વર્લ્ડ ઈનબોક્સ™

2018

32 કેટેગરી મુજબ

15,000+ પૂછાયેલા પ્રશ્નો

ઓબ્જેક્ટિવ તથા વન લાઈનર પ્રશ્નોનો સમાવેશ

• ગુજરાતનો ઈતિહાસ અને મહાગુજરાત આંદોલન • ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો • ભારતનો ઈતિહાસ • ભારતની કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો • વિશ્વનો ઈતિહાસ • ગુજરાતની ભૂગોળ • ગુજરાતના જિલ્લા • ભારતની ભૂગોળ • વસતી • વિશ્વની ભૂગોળ • ગુજરાતી સાહિત્ય • બંધારણ • પંચાયતી રાજ • કમ્પ્યૂટર • ભારતીય અર્થવ્યવસ્થા • સામાન્ય જ્ઞાન • રમત-ગમત • પુરસ્કાર • દિવસ • મહાનુભાવો • સામાન્ય વિજ્ઞાન • વિજ્ઞાન અને ટેકનોલોજી • ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ અને પ્રોજેક્ટો • સંસ્થા • પર્યાવરણ • જાહેર વહીવટ • કુદરતી આપત્તિ વ્યવસ્થાપન • કાયદો • મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર • ગુજરાતની વ્યાકરણ • અંગ્રેજી ગ્રામર • ગણિત અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતો •

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
+
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
+
ગુજરાત હાઈકોર્ટ
+
ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ
+
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
+
વિવિધ ભરતી મંડળ દ્વારા આયોજિત

કિંમત : ₹ 340/-

૩૦૦/

સંપાદક
કૌશિક પટેલ

પ્રત : 5000

WORLD INBOX
KNOWLEDGE SHARING PVT. LTD.

1935/A, First Floor, Office No.10, Girikandara Plaza, Near Sardarnagar, SBI Road, Bhavnagar - 364 001. Phone : 0278 - 2564445, 9099096116

VISIT…

LANZAROTE
Caliente.com

વર્લ્ડ ઈનબોક્સ

પ્રકાશક :

વર્લ્ડ ઈનબોક્સ

1935-A.10 પહેલા માળે,

ગિરિકંદરા પ્લાઝા,

સરદારનગર નજીક,

ભાવનગર-364001.

ફોન. 0278,- 2564445

મો. 9099096116

આવૃત્તિ :

પ્રથમ આવૃત્તિ

ફેબ્રુઆરી 2018

બીજી આવૃત્તિ

જુલાઈ 2018

કિંમત :

₹ 340/-

મુદ્રણ સ્થાન :

પ્રતિભા ઓફસેટ પ્રિન્ટર્સ,

GF-16, ગીતાંજલિ કોમ્પ્લેક્ષ,

ભાવનગર.

અનુક્રમણિકા

5.

6.

1)C,
15)A.

ગુજરાતનો ઈતિહાસ અને મહાગુજરાત આંદોલન

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?
   A) દામજીભાઈ-રેવતીબહેન B) દાનીયલભાઈ-ગંગાબહેન
   C) દુદાભાઈ-દાનીબહેન D) ધ્યાનચંદ - રેવાબહેન
2. એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના ક્યા દેશી રાજ્યમાં નોકરી કરી હતી?
   A) વડોદરા B) ગોંડલ C) ભાવનગર D) જામનગર
3. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?
   A) સર ચીનુભાઈ બેરોનેટ B) શેઠ અંબાલાલ સારાભાઈ
   C) બેરીસ્ટર જીવણલાલ દેસાઈ D) પ્રાણલાલ મહેતા
4. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેઓને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?
   A) મદનગોપાલ શર્મા B) અમૃતલાલ ઠક્કર
   C) જીવણલાલ બેરિસ્ટર D) ગોપાળકૃષ્ણ ગોખલે

રેવન્યૂ તલાટી - 28/02/2016

5. ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?
   A) સુરેન્દ્રનગર જિલ્લો B) ભાવનગર જિલ્લો
   C) જૂનાગઢ જિલ્લો D) અમદાવાદ જિલ્લો
6. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકાં જોડો.
   a) નવજીવન સાપ્તાહિક 1) ઉકાભાઈ પ્રભુદાસ
   b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી 2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
   c) પ્રજા હિતવર્ધક સભા 3) મોહનદાસ ગાંધી
   d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા 4) શ્યામજીકૃષ્ણ વર્મા
   A) c-1, a-3, b-4, d-2 B) b-1, c-2, d-4, a-3
   C) a-3, d-2, c-4, b-1 D) d-4, a-1, b-2, c-3

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

7. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્‌ઘાટન કોના દ્વારા થયું હતું?
   A) શ્રી મોરારજી દેસાઈ B) સુશ્રી શારદા મુખર્જી
   C) શ્રી નિલમ સંજીવ રેડ્ડી D) શ્રી ચિમનભાઈ પટેલ
8. 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?
   A) ભૂકંપ -2001 B) મોગલ આક્રમણ
   C) કટોકટી-1975 D) અયોધ્યા આંદોલન

PI પેપર - 2017

9. ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
   I. મૈત્રક II. યાદવ
   III. સોલંકી IV. ચાવડા
   A) II, I, IV, III B) IV, III, I, II
   C) I, III, IV, II D) I, IV, III, II
10. મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા.........વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી.
    A) પ્રધાન જવાહરલાલ નેહરુ B) મોરારજી દેસાઈ
    C) યશવંતરાય ચૌહાણ D) ઠાકોરભાઈ દેસાઈ
11. નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો?
    1. કસ્તુરબા 2. મણીબેન પટેલ
    3. મૃદુલા સારાભાઈ 4. પુષ્પાબેન મહેતા
    A) ફક્ત 1 અને 4 B) ફક્ત 1 અને 2
    C) ફક્ત 1, 2 અને 3 D) ફક્ત 1, 3 અને 4
12. ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે?
    A) શુંગ કાલીન B) ગુપ્ત કાલીન
    C) અનુગુપ્ત કાલીન D) મૌર્યકાલીન
13. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે- આ વિધાન કોનું છે ?
    A) રાજ નારાયણ બોઝ B) બાલ ગંગાધર તિલક
    C) ગાંધીજી D) પંડિત દીનદયાળ
14. ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો .... એ નાખ્યો હતો.
    A) સોલંકીઓ B) વાઘેલાઓ
    C) ચાવડાઓ D) મૈત્રકો
15. જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?
    A) જેમ્સ ટોડ B) જેમ્સ પ્રિન્સેપ
    C) જેમ્સ બર્ગેસ D) ભગવાનલાલ ઈન્દ્રજી

1)C, 2)A, 3)D, 4)B, 5)A, 6)A, 7)B, 8)C, 9)A, 10)A, 11)C, 12)A, 13)C, 14)C, 15)A.

16. ગીરનારનો શિલાલેખ.......સમયનો છે.
A) સોલંકી B) સલ્તનત
C) ગુપ્ત D) મૌર્ય

17. જૂનાગઢનું સુદર્શન તળાવ ક્યા કાળ દરમિયાન બંધાયું હતું ?
A) સૈંધવ B) પરમાર
C) સોલંકી D) મૌર્ય

18. ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?
A) આર.એસ.બીસ્ત B) રખાલદાસ બેનર્જી
C) માધોસ્વરૂપ વત્સ D) સર જહોન માર્શલ

19. જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી ક્યા રાજાનો ઉલ્લેખ નથી?
A) સમુદ્રગુપ્ત B) ચંદ્રગુપ્ત મૌર્ય
C) સ્કંદગુપ્ત D) રૂદ્રદમન

20. ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ?
A) મોહમ્મદ બેગડો B) સિકંદર
C) મહમદ-II D) બહાદુરશાહ

21. આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું ?
A) વિક્રમાદિત્ય-II B) નાગભટ્ટ-I
C) નાગભટ્ટ-II D) મીહિરભોજ નાગભટ્ટ-II

22. કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)..........રોજ અસ્તિત્વમાં આવ્યું.
A) 16 ઓગસ્ટ, 1947 B) 26 જાન્યુઆરી, 1948
C) 15 ફેબ્રુઆરી, 1948 D) 26 જાન્યુઆરી, 1950

23. ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ.............હતું.
A) બૈજુ B) સારંગદેવ
C) મર્દાન D) એકપણ નહીં

24. 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું ?
A) ડભોઈ B) ગિરનાર
C) સોમનાથ D) સુરત

GPSC પેપર - 1 - 2017

25. 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશ રાજને ગુજરાતના નીચેના પૈકી ક્યા શાસકોનું સમર્થન મળેલું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
i) બરોડાના ગાયકવાડ ii) ઈડરના રાજા
iii) રાજપીપળાના રાજા iv) નવાનગરના જામ
v) રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી-I
A) i, ii અને iii B) i, iii, iv અને v
C) i, ii, iii અને iv D) i, ii, iii, iv અને v

26. ગુજરાતના ક્યા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ?
A) ભીમા - I B) કુમારપાળ
C) ભીમા - II (ભોલા-ભીમા) D) કર્ણદેવ

27. નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?
A) તારંગાના મંદિરો B) મોઢેરાનું સૂર્ય મંદિર
C) રુદ્ર મહાલય D) ગોપનું મંદિર

28. નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.
1) ભીમદેવ-I 2) કુમારપાળ 3) સિદ્ધરાજ 4) દુર્લભરાજ
Codes :
A) 1, 3, 2, 4 B) 4, 1, 3, 2 C) 4, 3, 2, 1 D) 1, 3, 4, 2

29. ગુજરાતના નીચેના પૈકી ક્યા સુલ્તાને માળવા જીત્યું ?
A) અહમદશાહ B) મહંમદ બેગડો
C) બહાદુરશાહ D) મુઝફ્ફર - II

30. ગુજરાતના ક્યા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?
A) ભીમા - I B) કર્ણ C) કુમારપાળ D) ઝાફરખાન

31. 'ભાવનગર દરબાર સેવિંગ બેંક'ની સ્થાપના કોણે કરી ?
A) તખતસિંહજી B) ભાવસિંહજી-I
C) ભાવસિંહજી-II D) કૃષ્ણકુમારસિંહજી

32. એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી.
A) શેઠ શાંતિદાસ જવાહરી B) શેઠ લક્ષ્મીચંદ
C) શેઠ ખુશાલચંદ D) શેઠ શામલાજી

33. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.
A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
B) દાદાભાઈ નવરોજી
C) ખારશેદજી ફેરદુનજી પારેખ
D) વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા

34. કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?
A) ગોંડલના ભગવતસિંહજી (Bhagvatsinhji of Gondal)
B) રાજકોટના લાખાધિરાજ (Lakhadhiraj of Rajkot)
C) નવાનગરના રણજિતસિંહજી (Ranjeetsinhji of Navanagar)
D) મોરબીના વાઘજી- II (Waghji-II of Morbi)

35. ગુપ્તવંશના ક્યા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?
A) ચંદ્રગુપ્ત-I B) ઘટોત્કચ C) ચંદ્રગુપ્ત - II D) કુમારગુપ્ત-I

36. નીચેના પૈકી ક્યા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા?
A) રાષ્ટ્રકૂટ B) ગંગા
C) મૈત્રક D) ગુપ્ત પછીના

16)D, 17)D, 18)A, 19)A, 20)D, 21)C, 22)C, 23)A, 24)A, 25)A, 26)C, 27)D, 28)B, 29)C, 30)C, 31)C, 32)C, 33)A, 34)D, 35)C, 36)C.

GPSC MAINS પેપર - 1 - 2016

37. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌ પ્રથમ ક્યા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?
   A) દિવાનજી રણછોડજી B) દાદાભાઈ નવરોજી
   C) સર.ટી. માધવરાવ D) મનુભાઈ મહેતા
38. માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ?
   A) નર્મદ B) કરસનદાસ મૂળજી
   C) દુર્ગારામ મહેતા D) દલપતરામ
39. નીચેના પૈકી સૌરાષ્ટ્રના ક્યા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહો (હોસ્ટેલ)નું નિર્માણ થયેલ છે?
   A) મોરબી (મોવી) અને લીંબડી B) ગોંડલ અને પોરબંદર
   C) ભાવનગર અને નવાનગર D) રાજકોટ અને વાંકાનેર
40. ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?
   A) મુઝફ્ફરશાહ B) મિર્ઝા અઝીઝ કોકા
   C) નિઝામુદ્દીન બક્ષી D) ઉપરના પૈકી કોઈ નહી
41. ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે?
   A) મોહનલાલ પંડ્યા B) નરહરી પરીખ
   C) દ્વારકાદાસ તલાટી D) વામનરાવ મુકાદમ
42. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ?
   A) સિદ્ધરાજ B) મૂળરાજ C) ભીમદેવ D) કર્ણદેવ
43. ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ?
   A) હુ એન ત્સાંગ B) ફાહ્યાન C) ચા મીન D) સંગ યુન
44. બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક ક્યું હતું ?
   A) અમદાવાદ B) વડોદરા C) સુરત D) ખેડા
45. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?
   A) અમદાવાદ મિલ કામદારની હડતાલ
   B) ખેડા સત્યાગ્રહ
   C) બારડોલી સત્યાગ્રહ D) દાંડીકૂચ
46. સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું ?
   A) ભરૂચ B) વલ્લભી C) ખંભાત D) સુરત
47. 1947માં ગુજરાતના ક્યા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?
   A) નવાનગર B) પાલનપુર C) બાલાસિનોર D) જૂનાગઢ
48. ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ?
   A) 1 મે, 1963 B) 15 ઓગસ્ટ, 1963
   C) 26 જાન્યુઆરી, 1963 D) 1 એપ્રિલ, 1963
49. ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના ક્યા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?
   A) બરોડા B) જૂનાગઢ C) જામનગર D) ભાવનગર
50. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે?
   A) બાણાવલી B) ચન્હુદારો C) સુરકોટડા D) કાલીબંગા
51. ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી ક્યો પ્રાન્ત-પ્રદેશ ભાગ-સીમાં હતો ?
   A) આસામ B) હૈદરાબાદ C) સૌરાષ્ટ્ર D) કચ્છ

GPSC MAINS પેપર - 2 - 2016

52. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી ?
   A) શ્રી નારાયણ મલ્હાર જોશી B) શ્રી જગતરામ દવે
   C) શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર D) શ્રી ઘેલુભાઈ નાયક
53. ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?
   A) ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
   B) આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
   C) સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
   D) ઉપરના પૈકી કોઈ નહી

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

54. અલ્લાઉદીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ?
   A) સુરત સંગ્રામ B) રણમલચરિત
   C) કાન્હડદે પ્રબંધ D) રેવંતગિરિ રાસુ
55. મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો ક્યો હતો ?
   A) ઈ.સ.1860-1863 B) ઈ.સ.1960-1961
   C) ઈ.સ.1861-1862 D) ઈ.સ.1961-1963
56. સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?
   A) ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
   B) નીઝામુદીન અહમદ
   C) મુનીમખાન D) અસફખાન
57. ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?
   A) ભાવસિંહજી B) તખતસિંહજી
   C) વખતસિંહજી D) જસવંતસિંહજી
58. નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
   1. ખંડેરાવ ગાયકવાડ 2. ગોવિંદરાવ ગાયકવાડ
   3. ગણપતરાવ ગાયકવાડ 4. આનંદરાવ ગાયકવાડ
   A) 2, 4, 3, 1 B) 3, 1, 4, 2 C) 4, 2, 3, 1 D) 1, 3, 2, 4

37)B, 38)C, 39)A, 40)B, 41)A, 42)A, 43)A, 44)A, 45)B, 46)C, 47)D, 48)D, 49)A, 50)C, 51)D, 52)C, 53)B, 54)C, 55)C, 56)A, 57)B, 58)A.

59. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ?
A) ઈ.સ.1947 B) ઈ.સ.1948 C) ઈ.સ.1949 D) ઈ.સ.1950

60. અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ?
A) ઈ.સ.1915 B) ઈ.સ.1919 C) ઈ.સ.1922 D) ઈ.સ.1925

PSI GK - 1/1/2017

61. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?
A) જીવરાજ મહેતા B) હિતેન્દ્ર દેસાઈ
C) બળવંતરાય મહેતા D) ઘનશ્યામ ઓઝા

62. 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વિલિન થઈ હતી?
A) સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર B) સ્ટેટ બેંક ઓફ બિકાનેર
C) સ્ટેટ બેંક ઓફ ઈન્દોર D) કેનેરા બેંક

63. હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર ક્યું હતું ?
A) કાલીબંગન B) મોહન-જો-દરો
C) હરપ્પા D) લોથલ

64. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) સુરેન્દ્રનગર B) કચ્છ C) જૂનાગઢ D) અમદાવાદ

65. મોઢેરાનું સૂર્યમંદિર (Sun Temple) ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?
A) સિદ્ધરાજ જયસિંહ B) ભીમદેવ-1
C) કુમારપાળ D) કર્ણદેવ

66. પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?
A) રાણી ઉદયમતી B) નાઈકા દેવી
C) મીનળ દેવી D) રાણી રૂડાબાઈ

67. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?
A) મેહમૂદ બેગડા B) અહમદ શાહ-1
C) દાઉદ ખાન D) કુત્બુદ્દીન અહમદશાહ

68. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
A) પ્રતાપસિંહ B) જામરણજિતસિંહજી
C) સાયાજીરાવ ગાયકવાડ D) દિગ્વિજય સિંહજી

69. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ?
A) 12 માર્ચ, 1930 B) 6 એપ્રિલ, 1932
C) 12 માર્ચ, 1931 D) 6 એપ્રિલ, 1930

70. ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે
A) બારડોલી સત્યાગ્રહ B) ધરાસણા સત્યાગ્રહ
C) ખેડા સત્યાગ્રહ D) સાબરમતી સત્યાગ્રહ

71. 'આર્ય સમાજ'ની શરૂઆત ક્યા થઈ ?
A) ગુજરાત B) પંજાબ C) બંગાળ D) મહારાષ્ટ્ર

કોન્સ્ટેબલ - 23/10/2016

72. મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું-
A) અમદાવાદ B) કચ્છ C) પાટણ D) ચાંપાનેર

73. પાટણનાં પટોળાંની કલા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?
A) સિદ્ધરાજ જયસિંહના B) મૂળરાજ સોલંકીના
C) વનરાજ ચાવડાના D) ભીમદેવના

74. દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?
A) મહારાષ્ટ્ર B) ગુજરાત C) રાજસ્થાન D) મધ્યપ્રદેશ

કોન્સ્ટેબલ - 2015

75. 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહેલું ?
A) ગાંધીજી B) સરદાર વલ્લભભાઈ પટેલ
C) સરોજિની નાયડુ D) મહાદેવભાઈ દેસાઈ

76. સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
A) નર્મદા B) અમદાવાદ C) જામનગર D) કચ્છ

77. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં ક્યાં કુંડની નજીક આવેલો છે ?
A) આત્મ કુંડ B) ધીરજ કુંડ
C) દામોદાર કુંડ D) સૂરત કુંડ

78. શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ?
A) પોરબંદર B) મથુરા C) ભાવનગર D) રાજકોટ

79. સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?
A) કુમારપાળ B) કર્ણદેવ C) દુર્લભરાજ D) ચામુંડરાજ

80. મેહમૂદ 'બેગડો' કેમ કહેવાય છે ?
A) તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી
B) તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
C) તે બે ગણુ જમતો હતો તેથી
D) તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી

81. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
A) નરેન્દ્ર મોદી B) મોરારજી દેસાઈ
C) સરદાર પટેલ D) જવાહરલાલ નેહરુ

82. સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?
A) વલભી B) ધોળાવીરા C) હડપ્પા D) લોથલ

83. ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યા બંદર પર આવ્યા?
A) સુરત B) ભરૂચ C) ખંભાત D) સંજાણ

59)C, 60)A, 61)C, 62)A, 63)D, 64)B, 65)B, 66)A, 67)D, 68)C, 69)A, 70)C, 71)D, 72)D, 73)A, 74)C, 75)A, 76)D, 77)C, 78)A, 79)B, 80)D, 81)B, 82)D, 83)D.

84. ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?

A) ઈ.સ.1928 B) ઈ.સ.1930

C) ઈ.સ.1932 D) ઈ.સ.1935

85. ગુજરાતનો સ્થાપના દિન ક્યો છે ?

A) 1 મે, 1960 B) 1 જૂન, 1960

C) 1 જુલાઈ, 1960 D) 1 ઓગસ્ટ, 1960

બિન સચિવાલય ક્લાર્ક - 2016

86. મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જઝિયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?

A) ઔરંગઝેબ B) મુઝફ્ફર શાહ

C) અકબર D) અલાઉદ્દીન ખીલજી

87. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃતિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.

a) સ્વતંત્રતા અખબાર 1) ઈમામ સાહેબ

b) ડુંગળી ચોર 2) ઈચ્છારામ દેસાઈ

c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ 3) શ્યામજીકૃષ્ણ વર્મા

d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી 4) મોહનલાલ પંડ્યા

A) a-4, d-3, c-2, b-1 B) c-1, a-2, d-3, b-4

C) b-4, c-1, a-3, d-2 D) a-3, b-1, d-2, c-4

88. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

A) કર્તિ મંદિર B) કોચરબ આશ્રમ

C) વેડછી આશ્રમ D) ગાંધી આશ્રમ

89. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા?

A) મણિનગર B) વડોદરા

C) રાજકોટ

D) (A), (B) અને (C) ત્રણેયમાંથી એકપણ નહીં

90. "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનોરીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

A) વલ્લભભાઈ પટેલ B) મોહનદાસ ગાંધી

C) ઈન્દુલાલ યાજ્ઞિક D) જયપ્રકાશ નારાયણ

91. ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ?

A) લાલપુર B) ખંભાળિયા C) પડધરી D) ધ્રોલ

92. ક્રાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.

A) લીમડી B) ઉના C) ખંભાત D) દીવ

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

93. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

A) અમૂલચંદ બારીયા B) ઈશ્વરભાઈ પટેલ

C) ડૉ. કુરિયન D) ત્રિભુવનદાસ પટેલ

94. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

A) હિંદ છોડો ચળવળ B) અહિંસા આંદોલન

C) દાંડી યાત્રા D) બારડોલી સત્યાગ્રહ

95. ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

A) 25 ડિસેમ્બર B) 2 ઓક્ટોબર

C) 31 ઓક્ટોબર D) 26 જાન્યુઆરી

96. ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર' આજે ક્યા નામથી ઓળખાય છે ?

A) સુલતાનપુર B) અમદાવાદ C) મહેમદાવાદ D) હિંમતનગર

97. ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?

A) કેશુભાઈ પટેલ B) માધવસિંહ સોલંકી

C) નરેન્દ્રભાઈ મોદી D) અમરસિંહ ચૌધરી

98. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

A) કિસાન-મજદૂર આંદોલન B) ભારત છોડો

C) સવિનય કાનૂન ભંગ D) આઝાદ હિન્દ ચળવળ

99. ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

A) ચારુમતિબેન યોધ B) માયાબેન કોડનાની

C) ઈન્દુમતિબેન શેઠ D) આનંદીબેન પટેલ

100. ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે?

A) કરમસદ B) બારડોલી C) ધર્મજ D) ઉવારસદ

101. ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી?

A) નિત્યાનંદ કાનુંગો B) મહેદી નવાઝજંગ

C) શ્રીમન્ નારાયણ D) પી.એન. ભગવતી

102. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

A) એકશન ફોર ગ્લોબલ વોર્મિંગ

B) ધ કન્વીનીઅન્ટ એકશન

C) ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ

D) ધ એકશન ઓન એન્વાયરમેન્ટ

103. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલું હતું?

A) રાજસ્થાન B) મધ્ય પ્રદેશ C) મહારાષ્ટ્ર D) ઉત્તર પ્રદેશ

104. ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?

A) અમરસિંહ ચૌધરી B) હિતેન્દ્રભાઈ દેસાઈ

C) બળવંતરાય મહેતા D) ઘનશ્યામભાઈ ઓઝા

84)B, 85)A, 86)A, 87)B, 88)B, 89)D, 90)D, 91)D, 92)A, 93)D, 94)C, 95)C, 96)D, 97)B, 98)C, 99)C, 100)B, 101)B, 102)B, 103)C 104)C.

105. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ?
A) જાપાન B) અમેરિકા C) ફ્રાન્સ D) ઈંગ્લેન્ડ

106. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ?
A) ગૃહમંત્રી B) સ્પીકર C) વિદેશ મંત્રી D) સ્વાસ્થ્ય મંત્રી

107. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?
A) સન્યાસ આશ્રમ B) ગાંધી આશ્રમ
C) શિવાનંદ આશ્રમ D) કોચરબ આશ્રમ

108. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો?
A) માધવસિંહ સોલંકી B) હિતેન્દ્રભાઈ દેસાઈ
C) અમરસિંહ ચૌધરી D) નરેન્દ્રભાઈ મોદી

109. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?
A) કરમસદ B) અમદાવાદ
C) બારડોલી D) વલ્લભ વિદ્યાનગર

110. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે?
A) શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ
B) શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
C) શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય
D) શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ

111. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
A) કાર્બન ડેટિંગ B) સેન્ટ્રિફ્યૂઝ
C) PMT D) ઈલેક્ટ્રોફોરેસિસ

GPSC પ્રિલિમ - 2001

112. આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી?
A) કીર્તિમંદિર B) હદયકુંજ
C) ગૂજરાત વિદ્યાપીઠ D) અક્ષરધામ

113. આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડયું નથી ?
A) બાબુભાઈ જે. પટેલ B) માધવસિંહ સોલંકી
C) કેશુભાઈ પટેલ D) અમરસિંહ ચૌધરી

114. પાટણમાં આવેલી "રાણકી વાવ" કોણે બંધાવી
A) ઉદયમતી B) મીનળદેવી C) દેવળદેવી D) ચૌલાદેવી

115. શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું?
A) કુમારપાળ B) ભીમદેવ
C) સિદ્ધરાજ જયસિંહ D) વનરાજ ચાવડો

116. ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?
A) ડો.જીવરાજ મહેતા B) ચીમનભાઈ પટેલ
C) બળવંતરાય મહેતા D) હિતેન્દ્ર દેસાઈ

117. "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ?
A) કર્ણ B) યુધિષ્ઠિર
C) ચીમનભાઈ પટેલ D) આમાનું કોઈ નહીં

118. આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?
A) હિતેન્દ્ર દેસાઈ B) ડો.જીવરાજ મહેતા
C) બળવંતરાય મહેતા D) પ્રબોધ રાવળ

119. 'છેલ્લો કટોરો આ ઝેરનો બાપું' કોણે ગાયું ?
A) ઝવેરચંદ મેઘાણી B) દુલાભાયા કાગ
C) ઉમાશંકર જોષી D) કાન્ત

GPSC પ્રિલિમ - 2007

120. ગુજરાતમાં 'બારડોલી સત્યાગ્રહ' સાથે કોનું નામ જોડાયેલું છે ?
A) મહાત્મા ગાંધી B) સરદાર પટેલ
C) મોરારજી દેસાઈ D) શામળદાસ ગાંધી

121. નીલમબાગ પેલેસ ક્યા શહેરમાં છે ?
A) જામનગર B) વડોદરા C) ભાવનગર D) મોરબી

122. જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' ક્યા શહેરમાં આવેલો છે ?
A) પોરબંદર B) રાજકોટ C) ભાવનગર D) અમદાવાદ

123. ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી ?
A) સનત મહેતા B) વજુભાઈ વાળા
C) છબીલદાસ મહેતા D) અશોક ભટ્ટ

GPSC પ્રિલિમ - 2014

124. ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાઈ છે તેવી ઘટના આકાર પામી -
A) બારડોલી સત્યાગ્રહ B) પ્રાંતીય સરકારોની ઘોષણા
C) પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા અને ઠરાવ
D) દાંડી યાત્રા - મીઠાનો સત્યાગ્રહ

125. મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ ક્યું ?
A) પ્રભાસ B) ડાકોર C) ઓખા D) મથુરા

126. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ?
A) સાયમન કમિશન B) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
C) ગોળમેજી પરિષદ D) ચૌરીચોરા

105)D, 106)C, 107)D, 108)D, 109)B, 110)B, 111)A, 112)D, 113)D, 114)A, 115)C, 116)C, 117)C, 118)D, 119)A, 120)B, 121)C, 122)B, 123)B, 124)D, 125)A, 126)C.

PSI ખાતાકીય - 23/04/2017

127. ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ?
A) શિવાનંદ B) સન્યાસ C) સાબરમતી D) કોચરબ

128. મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?
A) ગુજરાત વિદ્યાપીઠ B) સંસ્કૃત યુનિવર્સિટી
C) ગુજરાત યુનિવર્સિટી D) લોકભારતી વિદ્યાપીઠ

129. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર'નું બિરુદ પ્રાપ્ત થયું હતું ?
A) ધરાસણાનો સત્યાગ્રહ B) મીઠાનો સત્યાગ્રહ
C) ખેડાનો સત્યાગ્રહ D) બારડોલીનો સત્યાગ્રહ

130. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?
A) ભૂદાન સત્યાગ્રહ B) બારડોલી સત્યાગ્રહ
C) મીઠાનો સત્યાગ્રહ D) વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ

PSI/ASI GK - 2/5/2015

131. ડો.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા.
A) ત્રીજા B) પહેલા C) બીજા D) એક પણ નહીં

132. નંસિરૂદિન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?
A) બલબન યુગ B) સલ્તનત યુગ
C) ખીલજી યુગ D) સોલંકી યુગ

133. ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?
A) ખંભાત B) ભરૂચ C) કચ્છ D) ભાવનગર

134. સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?
A) વાઘેલા વંશ B) ચાવડા વંશ C) સોલંકી વંશ D) મૈત્રક વંશ

135. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ?
A) ઉદયમતી B) ચૌલાદેવી C) રાણકદેવી D) તારામતી

136. ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?
A) મૈત્રક યુગ B) ચાવડા યુગ C) શર્યાતિ યુગ D) સલ્તનત યુગ

137. ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?
A) અમદાવાદ-વડોદરા B) અમદાવાદ-મણીનગર
C) મહેસાણા-વીજાપુર D) ઉતરાણ-અંકલેશ્વર

138. જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ?
A) ઉજ્જૈન B) મગધ C) કલિંગ D) પાટણ

139. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું ?
A) કુમારપાલ B) વીર ધવલ C) પિસલદેવ D) ભીમદેવ પહેલો

140. ગુજરાતના ઈતિહાસમાં 'અશોક' તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે.
A) કુમારપાળ B) ભીમદેવ પહેલો
C) સિદ્ધરાજ જયસિંહ D) અજયપાળ

GPSC Class-1 - 2016

141. અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું ?
A) 1568 B) 1572 C) 1576 D) 1579

142. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?
A) કૌટિલ્યનું ''અર્થશાસ્ત્ર''
B) હેમચંદ્રાચાર્યનું ''પરિશિષ્ટપર્વ''
C) વિશાખદત્ત ''મુદ્રારાક્ષસ''
D) વિશાખદત્ત ''દેવીચંદ્રગુપ્તમ''

143. 1930-31ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યુ હતું ?
A) સયાજીરાવ ત્રીજા B) ભગવતસિંહ
C) કૃષ્ણકુમારસિંહ D) જામ રણજિતસિંહ

144. પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?
A) મહાત્મા ગાંધી B) વિઠ્ઠલભાઈ પટેલ
C) વલ્લભભાઈ પટેલ D) જામ રણજિતસિંહ

145. સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું?
A) પ્રદેશ B) પથક C) મંડલ D) રાષ્ટ્ર

146. સૌરાષ્ટ્રમાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?
A) નવલરામ B) મણીશંકર કીકાણી
C) મનસુખરામ ત્રિપાઠી D) મણીલાલ દ્વિવેદી

147. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનનો કયા તબક્કાને રજૂ કરે છે ?
A) ગાંધીજીના બાળપણને B) ગાંધીજીના આફ્રિકાવાસને
C) ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
D) ગાંધીજીના નોઆખલીના દિવસોને

148. જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો?
A) જૂનાગઢનો નવાબ B) જૂનાગઢનો વઝીર
C) જૂનાગઢનો સેનાપતિ D) જૂનાગઢનો ખજાનચી

149. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" (Salt Mountain) કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ?
A) ગાંધીનગર B) પોરબંદર C) દાંડી D) બારડોલી

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

150. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું?
A) મીનળ દેવી B) અજય પાળ
C) ભીમદેવ પહેલો D) સિધ્ધરાજ જયસિંહ

127)D, 128)A, 129)C, 130)C, 131)B, 132)B, 133)B, 134)B, 135)A, 136)D, 137)D, 138)B, 139)D, 140)A, 141)B, 142)B, 143)D, 144)B, 145)C, 146)B, 147)B, 148)B, 149)A, 150)D.

151. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાનો અને તેમનાં સમયકાળનાં આધારે પ્રથમથી નીચેના ક્રમમાં ગોઠવો.

1) મા.જીવરાજ મહેતા A) પ્રથમ
2) બળવંતરાય મહેતા B) બીજા
3) હિતેન્દ્રભાઈ દેસાઈ C) ત્રીજા
4) ઘનશ્યામભાઈ ઓઝા D) ચોથા

A) 1-B, 2-C, 3-D, 4-A B) 1-A, 2-B, 3-C, 4-D
C) 1-C, 2-D, 3-A, 4-B D) 1-D, 2-A, 3-B, 4-C

GPSC Class - 2 - 29/1/2017

152. મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે?

A) જામા મસ્જિદ, અમદાવાદ
B) મહમ્મદ બેગડાની કબર, ચાંપાનેર
C) રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ
D) ઉપરના બધા જ

153. ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી ક્યા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું?

A) મૈત્રક વંશ B) સોલંકી વંશ
C) ચાલુક્ય વંશ D) પરિહાર વંશ

154. દિલ્હી સલ્તનતનો સુલ્તાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14 મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો?

A) અકબર B) અલાઉદીન ખીલજી
C) તૈમુર D) ચંગીઝખાન

155. મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી?

A) દારા શિકોહ B) ઔરંગઝેબ
C) મુરાદ બક્ષ D) ઉપર દર્શાવેલ બધા જ

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

156. સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?

A) મોહેંને-જો-દડો B) લોથલ
C) ચાન્હુડરો D) ધોળાવીરા

157. ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી?

A) જટરા ભગત B) તીરૂતસિંહ અને બંમનાયક
C) રૂપસિંહ અને જોગીયા ભગત D) ઉપરના પૈકી કોઈ નહી

158. શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહિદ થયા હતા?

A) બારડોલી સત્યાગ્રહ B) મહાગુજરાત ચળવળ
C) હિન્દ છોડો ચળવળ D) ખેડા સત્યાગ્રહ

159. "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી?

A) ઠક્કર બાપા B) નારાયણગુરૂ
C) ગાંધીજી D) સરદાર વલ્લભભાઈ પટેલ

GPSC Class - 2 - 18/12/2016

160. કચ્છમાં નીચે પૈકી ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે?

A) બેલા B) ખાદીર
C) પચ્છમ D) ઉપરોક્ત એક પણ નહી

161. 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબહર' હોદ્દો ક્યા અધિકારીને આપવામાં આવતો?

A) પાયદળના વડા B) વજીર
C) રાજાના અંગત મદદનીશ D) નૌસેનાના વડા

162. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહિદ થયા હતા?

A) ઝંડા સત્યાગ્રહ B) હિંદ છોડો આંદોલન
C) નવનિર્માણ આંદોલન D) અસહકાર આંદોલન

163. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી?

A) 2જી ઓક્ટોબર, 1920 B) 18મી ઓક્ટોબર, 1920
C) 2જી ઓક્ટોબર, 1948 D) 18મી ઓક્ટોબર, 1948

164. રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે?

A) ભીંતચિત્રો B) શૈલ ગુફાઓ C) સ્તૂપ D) સ્તંભાલેખ

165. આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?

A) 9 નવેમ્બર B) 9 ઓક્ટોબર C) 10 નવેમ્બર D) 10 ઓક્ટોબર

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

166. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો?

A) મહંમદ ઘોરી B) અકબર
C) અહમદશાહ D) અલ્લાઉદ્દીન ખીલજી

167. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?

A) મંડી B) સુરકોટડા C) કુન્તાસી D) પાદરી

168. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું?

A) અમરેલી B) સુરત C) અમદાવાદ D) દિલ્હી

169. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું?

A) 1963 B) 1965 C) 1971 D) 1976

170. સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા?

A) ગુજરાતના સુલ્તાન B) સૂફી સંત
C) સુલ્તાન ન્યાયાધીશ D) ગુલામ

151)B, 152)D, 153)A, 154)B, 155)D, 156)D, 157)C, 158)C, 159)A, 160)B, 161)D, 162)B, 163)B, 164)B, 165)A, 166)D, 167)A, 168)B, 169)C, 170)D.

GPSC Class - 2 - 12/2/2017

171. 1947 માં ગુજરાતનાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો?
A) નવાનગર B) પાલનપુર C) બાલાસિનોર D) જૂનાગઢ

172. ગિરાસદારી પ્રથા નાબુદ કરતો " સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો?
A) 1950 B) 1951 C) 1952 D) 1953

173. શ્રી મોહનલાલ પંડયા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલ હતા?
A) ખેડા સત્યાગ્રહ B) અમદાવાદ મિલ કામદાર હડતાલ
C) બારડોલી સત્યાગ્રહ D) દાંડીકૂચ

174. નીચેના વાકયો પૈકી વાકયો સાચા છે?
A) ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
B) જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
C) મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
A) 1 અને 2 B) 2 અને 3 C) 1 અને 3 D) 1, 2 અને 3

GPSC Class-1 - 15/01/2017

175. ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે?
A) રૂદ્રદામનનો જૂનાગઢમાં આવેલ શિલાલેખ
B) અશોકનો ગિરનારમાં આવેલ શિલાલેખ
C) અશોકનો સોપારાનો શિલાલેખ
D) કલિંગ શિલાલેખ

176. ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો.
1) મૌર્ય યુગ 2) સોલંકી યુગ 3) ગુપ્ત યુગ 4) વાઘેલા યુગ
A) 1, 4, 2, 3 B) 1, 3, 2, 4 C) 1, 2, 4, 3 D) 1, 3, 4, 2

177. અંગ્રેજોએ ગુજરાતમાં સીધુ શાસન કરેલ હોય તેવું ક્યું રાજય હતું?
A) બ્રોચ (ભરૂચ) B) કાઠિયાવાડ
C) કચ્છ D) દાદરા અને નગરહવેલી

178. કયા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજયની સ્થાપના કરી?
A) હુમાયુ B) બાબર C) અકબર D) શાહજહા

179. ઈ.સ.1802માં સુરત આપીને બ્રિટીશ સામ્રાજયમાં જોડાવાની સંધિ કોણે કરી હતી?
A) દામાજી ગાયકવાડ B) મોરાજી દેસાઈ
C) આનંદરાવ ગાયકવાડ D) ઉપર પૈકી એકપણ નહી

180. કયા યુગ દરમ્યાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા?
A) ગુપ્ત યુગ B) મૈત્રક યુગ C) અનુમૈત્રક યુગ D) સોલંકી યુગ

181. કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી?
A) શાહજહા B) ઔરંગઝેબ
C) અકબર D) સુલતાન મુઝફ્ફરશાહ

182. ઈ.સ.1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી?
A) કુતુબુદ્દીન એહમદશાહ B) ગિયાસુદ્દીન મહંમદશાહ
C) નસીરૂદ્દીન D) મુઝફ્ફરશાહ પ્રહેલો

183. યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે, તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1) સૂર્યમંદિર - મોઢેરા 2) ચાંપાનેર-પાવાગઢ
3) સીદી સૈયદની જાળી - અમદાવાદ 4) સરખેજનો રોજો - અમદાવાદ
A) 2 B) 1, 2, 3 C) 1, 3, 4 D) 1, 2, 3, 4

GPSC Class-1 - 15/01/2017

184. ઈ.સ. .... માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો.
A) 1929 B) 1942 C) 1928 D) 1930

185. ઈ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
A) 132 B) 154 C) 168 D) 182

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

186. રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તીની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા ?
A) સરદાર વલ્લભભાઈ પટેલ B) શ્રી અરવિંદ ઘોષ
C) મેડમ કામા D) ડૉ. મથુરસિંહ

187. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?
A) અકબર B) જહાંગીર C) શાહજહાં D) ઔરંગઝેબ

GPSC Class - 2 - 16/04/2017

188. "સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું?
A) ગાંધી આશ્રમ B) સત્યાગ્રહ આશ્રમ
C) ફીનીક્સ ફાર્મ D) દાંડી આશ્રમ

171)D, 172)B, 173)A, 174)D, 175)A, 176)B, 177)A, 178)C, 179)A, 180)C, 181)B, 182)D, 183)A, 184)D, 185)C, 186)B, 187)D, 188)B.

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

189. હિંદ સ્વરાજના લેખક કોણ છે ?
A) કાકાસાહેબ કાલેલકર B) ક.મા.મુનશી
C) સ્વામી આનંદ D) મહાત્મા ગાંધી

190. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી?
A) મહમંદ બેગડાએ B) કુમારપાળ
C) શોભનદેવ D) સિદ્ધરાજ જયસિંહ

191. ગિરનારની તળેટીમાં ક્યા રાજવીના શિલાલેખો છે ?
A) સ્કંદગુપ્ત B) સમ્રાટ અશોક
C) રુદ્રદામન D) ઉપર દર્શાવેલ ત્રણેયના

192. અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?
A) રાણી સિપ્રીની B) સીદી બશીરની
C) જુમ્મા મસ્જિદ D) ઉપર પૈકી એકપણ નહીં

193. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
A) વસ્તુપાલ-તેજપાલ B) કુમારપાળ
C) વિમલમંત્રી D) શોભનદેવ

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

194. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?
A) મૌર્ય વંશ B) ગુપ્ત વંશ C) વાઘેલા વંશ D) સોલંકી વંશ

195. જૂનાગઢની "આરઝી હકૂમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
A) કનૈયાલાલ મુનશી B) શામળદાસ ગાંધી
C) રતુભાઈ અદાણી D) મહોબતખાન

196. વ્યક્તિદીઠ કેટલાં રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો?
A) 1.50 B) 2.50 C) 3.50 D) 4.50

197. "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે?
A) કુમારપાલ B) વસ્તુપાલ C) તેજપાલ D) યશચંદ્ર

198. વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં?
A) ભરૂચ B) ગુજરાત કૉલેજ, અમદાવાદ
C) કલેક્ટર કચેરી, નડીયાદ D) કાળુપૂર પોલીસ સ્ટેશન

199. "નવજીવન" માસિક કોણે શરૂ કર્યું હતું?
A) ગાંધીજી B) ભીમજી પારેખ C) ફરદુનજી D) ઈન્દુલાલ

200. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?
A) ખેડૂતો B) લોકો
C) ઔદ્યોગિક કામદારો D) મજૂરો

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

201. નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો.
1) બોરસદ સત્યાગ્રહ 2) ખેડા સત્યાગ્રહ
3) ધરાસણા સત્યાગ્રહ 4) બારડોલી સત્યાગ્રહ
A) 2,1,4,3 B) 3,4,2,1 C) 2,3,4,1 D) 4,1,3,2

202. ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી ક્યા જિલ્લામાં આવેલું છે?
A) અહમદાવાદ B) કચ્છ C) રાજકોટ D) સુરેન્દ્રનગર

203. દેલવાડાનાં દેરાંની બહારના ભાગમાં આવેલાં બે ગોખ કોના નામે ઓળખાય છે?
A) રિદ્ધી અને સિદ્ધી B) ગંગા અને યમુના
C) જ્યા અને પાર્વતી D) લલિતાદેવી અને અનુપમાદેવી

204. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયાં જિલ્લામાં આવેલી છે?
A) કચ્છ B) જૂનાગઢ C) રાજકોટ D) સાબરકાંઠા

205. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી?
A) ગાંધીજી B) કુંવરજીભાઈ
C) વિઠ્ઠલભાઈ D) રવિશંકર મહારાજ

206. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી?
A) મોહનલાલ પંડયા B) જુગતરામ દવે
C) સરોજિની નાયડુ D) મહાદેવભાઈ દેસાઈ

207. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું?
A) કર્ણાવતી B) પાટણ C) સિદ્ધપુર D) વલભી

GPSC Class - 1 - 28/01/2017

208. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?
A) રોજડી B) ભુજ C) રાણપુર D) ધોળાવીરા

209. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે?
A) સરદાર વલ્લભભાઈ પટેલ B) મૌલાના આઝાદ
C) મહાદેવભાઈ દેસાઈ D) સુભાષચંદ્ર બોઝ

નાયબ ચિટનીશ - 02/06/2015

210. ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું?
A) સિવિલ હોસ્પિટલ B) મણિનગર
C) આંબાવાડી D) ભદ્ર

211. 'આરઝી હકૂમત'ની સ્થાપના ....ખાતે કરવામાં આવી હતી.
A) મુંબઈ B) અમદાવાદ C) જૂનાગઢ D) સુરત

189)D, 190)A, 191)D, 192)B, 193)C, 194)D, 195)B, 196)B, 197)B, 198)B, 199)D, 200)C, 201)A, 202)C, 203)D, 204)C, 205)B, 206)C, 207)D, 208)D, 209)C, 210)C, 211)A.

નાયબ ચિટનીશ - 05/02/2017

212. મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું કયું વિધાન સાચું છે ?
A) કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો.
B) પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યાર બાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
C) બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી.
D) પહેલા સાબરમતી આશ્રમ અને ત્યાર બાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી.

213. મહંમદ ગઝનીની સોમનાથ ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલ હતા ?
A) લાઠીનો ગોહિલ રાજવંશ B) મેવાડનો ગોહિલ રાજવંશ
C) મહુવાનો ગોહિલ રાજવંશ D) ભાવનગરનો ગોહિલ રાજવંશ

214. 'અભયઘાટ' કોની સમાધિ છે ?
A) રાજીવ ગાંધી B) લાલબહાદુર શાસ્ત્રી
C) મોરારજી દેસાઈ D) ઈન્દિરા ગાંધી

GPSC Class - 2 - 16/04/2017

215. ગુજરાતના ક્યા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા ?
A) વઢવાણ B) સાણંદ C) મોરબી D) લીંબડી

216. 'સિદ્ધહેમશબ્દાનુંશાસન' ક્યા વિષયનો ગ્રંથ છે?
A) સંગીત B) વ્યાકરણ
C) રાજ્ય વહીવટ D) જ્યોતિષ શાસ્ત્ર

217. અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો?
A) અકબર B) દારા-શુકોહ C) શાહજહા D) મુરદબક્ષ

218. જૂનાગઢની મૂકિત માટે રચાયેલ આરઝી હકૂમતનાં વડા કોણ હતા?
A) દયાશંકર દવે B) રસિકલાલ પરીખ
C) રતુભાઈ અદાણી D) શામળદાસ ગાંધી

219. મહાગુજરાતમાં ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા?
A) ઈન્દુલાલ યાજ્ઞિક B) પ્રબોધ રાવળ
C) હરિહર ખંભોળજા D) રમણલાલ શેઠ

GPSC Class - 2 - 02/04/2017

220. કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ?
A) ભીમદેવ 1લો B) વિસલદેવ C) કુમારપાળ D) દેવસૂરિ

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

221. કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિકસે તે સારૂ રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?
A) માંડવી B) કંડલા C) જખાઉ D) મુંદ્રા

222. પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
A) સેનાપતિ ભટ્ટાર્ક B) ધરાસેના-II
C) દ્રોણાસિંહમા D) ધ્રુવાસેના-I

223. કાઠીયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ?
A) રામસિંહ B) રાઉ કરણ સિંહ
C) ચંપત રાય D) ચક્રધ્વજ

GPSC Class - 2 - 12/02/2017

224. ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે?
A) બી.બી.લાલ B) એસ.આર.રાવ
C) બી.એન.મિશ્રા D) આર.એસ.બિસ્ત

225. કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે?
A) અશોક B) સમુદ્રગુપ્ત
C) હર્ષ D) ઉપર પૈકી એક પણ નહી

226. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાકનકર્તા હતા કે જેઓએ
A) વડોદરામાં સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત કરી.
B) ભારતીય સંઘમાં જોડાયા
C) રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
D) રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.

227. શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ ક્યા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે?
A) શંકરાચાર્ય B) કલકાચાર્ય
C) વલ્લભાચાર્ય D) આચાર્ય નાગાર્જુન

228. કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી?
A) ઈત્સિંગ B) હ્યુએનસંગ
C) ઉપરના બન્ને D) ઉપરના કોઈપણ નહી

229. ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે સ્થાપી હતી?
A) મુસલીપટ્ટમ B) સુરત C) પોંડીચેરી D) કલકત્તા

212)B, 213)A, 214)C, 215)B, 216)B, 217)C, 218)D, 219)A, 220)A, 221)B, 222)A, 223)A, 224)B, 225)A, 226)C, 227)B, 228)C, 229)B.

GPSC Class - 1 - 09/04/2017

230. હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી ક્યા સ્થળેથી મળી આવ્યા છે ?
A) લોથલ B) રંગપુર C) ધોળાવીરા D) રોજડી

231. પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફૂટનું નામ ગુજરાતમાં ક્યા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?
A) આદિઅશ્મયુગ B) નવાશ્મયુગ
C) લોહયુગ D) ઉપર પૈકી એકપણ નહીં

232. માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો?
A) ભીમદેવ સોલંકી પહેલો B) ભીમદેવ સોલંકી બીજો
C) વિજય દેવ D) ઉપર પૈકી એકપણ નહીં

233. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ ક્યા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું ?
A) મૈત્રક વંશ B) સોલંકી વંશ
C) ચાલુક્ય વંશ D) પરિહાર વંશ

234. સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS) કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ?
A) મહારાષ્ટ્ર B) ગોવા C) ગુજરાત D) મધ્યપ્રદેશ

GPSC Class - 2 - 04/03/2017

235. ગુજરાતના ક્યા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટિયાં કે બોર્ડ" (Harappan Sign-Boards) મળી આવ્યા છે ?
A) રોજડી B) લોથલ C) ધોળાવીરા D) સુરકોટડા

236. ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનકાળ દરમ્યાન ક્યા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ?
A) વઝીર B) વઝીરમંડળનો વડો
C) સેનાપતિ કે સૈન્યનો વડો D) સુલ્તાન સ્વયં આ હોદો ધરાવતા

237. વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ?
A) ખંડણી B) લશ્કરી ખર્ચ
C) મહેસૂલ
D) ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ

GPSC Class - 2 - 18/03/2017

238. વન મહોત્સવ 2016 અંતર્ગત જાહેર કરાયેલા નવા વનોમાં "શહિદ વન" ક્યાં બનાવવામાં આવશે ?
A) બારડોલી B) બાલાચડી C) ભુચરમોરી D) વેરાખડી

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

239. પાટણના સિલ્કના પટોળા સાડીના વણાંટનો ઉદ્ભવ ક્યા શાસકોના સમયમાં થયેલ હતો ?
A) સોલંકી B) મૈત્રક C) ચાવડા D) ગુર્જર

240. ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?
A) મીરાબેન B) દિનબંધુ એન્ડ્રુઝ
C) જવાહરલાલ નેહરુ D) મહાદેવભાઈ દેસાઈ

241. 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ?
A) રતિલાલ સો. નાયક B) ચંદુલાલ બહેચરદાસ પટેલ
C) કે.કા. શાસ્ત્રી D) યોગેન્દ્ર વ્યાસ

242. જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયો હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?
A) શેર શાહ B) બહાદુર શાહ C) શાહ હુસૈન D) રાણા વિક્રમ

243. સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?
A) પુષ્પગુપ્ત B) તુરાષ્પા
C) પર્ણદત્ત D) ઉપર પૈકી એકપણ નહીં

244. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ?
A) પાટણ B) અમદાવાદ C) સોમનાથ D) સુરત

245. નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી ક્યો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ?
A) યાસ્તન B) રુદ્રદામા
C) અશોક D) ચન્દ્રગુપ્ત મૌર્ય

246. ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે ક્યા વર્ષમાં સ્થાપિત કરી ?
A) ઈ.સ.1411 B) ઈ.સ.1413 C) ઈ.સ.1423 D) ઈ.સ.1443

247. ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ?
A) 30 ડિસેમ્બર, 1948 B) 30 જાન્યુઆરી, 1950
C) 30 જાન્યુઆરી, 1948 D) 30 જાન્યુઆરી, 1949.

248. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું?
A) 1લી ડિસેમ્બર, 2016 B) 24મી ડિસેમ્બર, 2016
C) 26મી ડિસેમ્બર, 2016 D) 31મી ડિસેમ્બર 2016

249. ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં યુવારણ વીજમથકની શરૂઆત થઈ હતી ?
A) ડૉ. જીવરાજ મહેતા B) બળવંતરાય મહેતા
C) હિતેન્દ્રભાઈ દેસાઈ D) ચીમનભાઈ પટેલ

250. ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ?
A) મહીતપરામ રૂપરામ B) દયારામ
C) સૂરદાસ D) રણછોડદાસ

230)D, 231)A, 232)B, 233)A, 234)C, 235)C, 236)B, 237)A, 238)C, 239)A, 240)D, 241)B, 242)B, 243)C, 244)A, 245)B, 246)A, 247)C, 248)B, 249)B, 250)A.

251. કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?
A) અમરસિંહ ચૌધરી B) માધવસિંહ સોલંકી
C) છબીલદાસ મહેતા D) બાબુભાઈ જશભાઈ પટેલ

252. ગુજરાતના સૌપ્રથમ મહિલા રજ્યપાલ કોણ હતા ?
A) શારદાબેન મહેતા B) શારદાબેન મુખર્જી
C) પુષ્પાબેન મહેતા D) ઉષા મહેતા

253. 'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ કયા થયો હતો ?
A) ભાવનગર B) પંચમહાલ C) દાહોદ D) રાજપીપળા

254. ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ?
A) ડૉ.પી.કે.દાસ B) પ્રવિણ લહેરી
C) આર.એમ.પટેલ D) કૈલાશનાથન

255. ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?
A) માધવસિંહ સોલંકી B) ચીમનભાઈ પટેલ
C) અમરસિંહ ચૌધરી D) શંકરસિંહ વાઘેલા

256. નીચે દર્શાવેલ આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો.
1. અનામત વિરોધી આંદોલન 2. નવ નિર્માણ આંદોલન
3. મહાગુજરાત આંદોલન 4. પાટીદાર આંદોલન
A) 3, 2, 1, 4 B) 4, 2, 3, 1 C) 2, 4, 1, 3 D) 1, 4, 2, 3

GPSC Class - 2 - 11/12/2016

257. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
A) રાઘવજી લેઉઆ B) કલ્યાણજી મહેતા
C) માનસિંહ રાણા D) કુંદનલાલ ધોળકિયા

258. 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ?
A) ખજૂરાહો B) દેલવાડા
C) અજંતાની ગુફાઓ D) ખજૂરાહોની ગુફાઓ

259. સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જૂના) ઝાલાવાડ વિસ્તારમાં ક્યા ગામમાં આવેલો છે ?
A) જૈસવાડા B) ઝીંઝુવાડા C) નગવાડા D) માણેકવાડા

260. ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર ક્યા સ્થળે બાંધેલ છે ?
A) દ્વારકા B) સોમનાથ C) મૂળ દ્વારકા D) ડાકોર

261. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હરપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?
A) હડપ્પા B) મોહે-જો-દડો C) દેશળપર D) લોથલ

GPSC Class - 2 - 05/02/2017

262. ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે?
A) રમેશ જમીનદાર B) હરિભાઈ ગોદાણી
C) હિરાનંદ શાસ્ત્રી D) હસમુખ સાંકળીયા

263. આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?
A) ભીમદેવ પહેલો B) કર્ણદેવ
C) જયસિંહ સિદ્ધરાજ D) ઉદયાદિત્ય

264. ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું?
A) બહાદુર શાહ B) મુઝફ્ફરશાહ બીજો
C) મેહમુદ બેગડો D) એહમદશાહ

265. ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું?
A) પોર્ટુગીઝ B) મોગલ C) આરબો D) મરાઠા

266. ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા?
A) મહમદ બેગડા B) બહાદુરશાહ
C) અહમદશાહ પહેલો D) અહમદશાહ ત્રીજો

267. 1857 ના વિપ્લવની સાથે જ ગુર્જરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો
A) ઓખામંડળના વાઘેર
B) પાલનપુર અને બાલાસિનોરના બાબીઓ
C) માતરના ઠાકુર હરિસિંહ
D) લુણાવાડાના રામકિયા

268. ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનું 18મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા?
A) હરકોઈબાઈ અને રાકમબાઈ
B) વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
C) જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
D) કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ

269. ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
A) ભોલા ભીમ B) કુમારપાળ
C) કર્ણદેવ વાઘેલા D) લવણપ્રસાદ

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

270. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ?
A) દયારામ સાહની B) આર.એસ. વિષ્ટ
C) રખાલદાસ બેનર્જી D) એસ. આર.રાવ

271. સલ્તનકાળ દરમ્યાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી?
A) મુહમ્મદાબાદ-મહેમદાબાદ B) મુસ્તફાબાદ-જૂનાગઢ
C) અહમદગર-હિંમતનગર D) મુહમ્મદાબાદ-ચાંપાનેર

251)B, 252)B, 253)A, 254)A, 255)C, 256)A, 257)B, 258)B, 259)B, 260)B, 261)D, 262)D, 263)B, 264)C, 265)A, 266)C, 267)A, 268)B, 269)C, 270)D, 271)A.

272. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખિચડી" કહેવામાં આવતી હતી?
A) સરદેશમુખી B) ચૌથ C) મુલ્કગીરી D) ભાગ

273. ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરૂદ્ધ તોફાનો થયાં હતા?
A) દાંડી B) સુરત C) નવસારી D) રાજકોટ

274. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર-પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ....નું શાસન હતું?
A) ગારુલક વંશ B) સૈન્ધવ વંશ
C) સામંતસિંહ D) રાષ્ટ્રકૂટો

275. ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટ્ટ રાજાઓ કયા વંશના હતા?
A) ગુર્જર-પ્રતિહાર B) મૈત્રક
C) રાષ્ટ્રકૂટો D) ચાલુક્ય

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

276. ઈ.સ.1423માં અહેમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ?
A) વડોદરા B) સુરત C) રાજકોટ D) અમદાવાદ

277. દેવગિરિમાં કોનું શાસન હતું ?
A) યાદવોનું B) ચોલ વંશનું C) ચાલુક્યોનું D) રાષ્ટ્રકૂટોનું

278. સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ?
A) છ B) સાત C) આઠ D) પાંચ

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

279. દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ?
A) 12 માર્ચ, 1929 B) 12 માર્ચ, 1931
C) 12 એપ્રિલ, 1930 D) 12 માર્ચ, 1930

280. ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે ?
A) છબીલદાસ મહેતા B) આનંદીબેન પટેલ
C) કેશુભાઈ પટેલ D) વિજયભાઈ રૂપાણી

GSSSB મિકેનિક - 2017

281. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
A) 1920 B) 1917 C) 1915 D) 1930
(નોંધ : સાચો જવાબ 1918 આવશે.)

GSSSB સર્વેયર - 2016-17

282. ભગવદ્ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ?
A) જૂનાગઢ B) ગોંડલ C) ભાવનગર D) વાંકાનેર

283. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.
A) ચાંગદેવ B) ઋષભદેવ C) જીનદેવ D) હેમદેવ

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

284. સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા?
A) વિક્રમશીલા B) તક્ષશીલા C) વલભી D) નાલંદા

285. વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી?
A) સુલ્તાન અહમદશાહ પહેલો B) સુલ્તાન અહમદશાહ બીજો
C) સુલ્તાન અહમદશાહ ત્રીજો D) સુલ્તાન અહમદશાહ ચોથો

286. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો?
A) ચંદ્રગુપ્ત મૌર્ય B) અશોક
C) રુદ્રદામા D) સ્કન્દગુપ્ત

287. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો?
A) કુલીજખાન B) મીરઝા અબ્દુલ રહીમખાન
C) શિહાબુદ્દિન અહમદખાન D) મીરઝા અઝીઝ કોકા

વિસ્તરણ અધિકારી - 7/1/2017

288. ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
A) 1957 B) 1962 C) 1964 D) 1967

289. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ?
A) 182 B) 180 C) 172 D) 192

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

290. સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.
A) વજુભાઈ ભાનુશાળી B) ઉચ્છંગરાય ઢેબર
C) પ્રતાપભાઈ ઢેબર D) મધુપ્રસાદ ગાંગલિયા

291. સન 1884 - 85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
A) મહારાજા ઉપેન્દ્રસિંહજી B) મહારાજા તખતસિંહજી
C) મહારાજા શામળસિંહજી D) મહારાજા ભાવસિંહજી

272)C, 273)B, 274)D, 275)B, 276)D, 277)A, 278)B, 279)D, 280)D, 281)B, 282)B, 283)A, 284)C, 285)A, 286)C, 287)D, 288)B, 289)A, 290)B, 291)B.

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

292. 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?
A) અનસુયાબેન B) ઈન્દુલાલ યાજ્ઞિક
C) શંકરલાલ બેંકર D) નરહરિ પરીખ

293. ક્યા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?
A) સુરત B) અમદાવાદ C) જામનગર D) જૂનાગઢ

PSI/ASI ગુજરાતી - 2/5/2015

294. ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
A) એદલજી ડોસાભાઈ B) ગોવર્ધનરામ ત્રિપાઠી
C) કનૈયાલાલ મુનશી D) રમણભાઈ નીલકંઠ

295. ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ?
A) ચાર B) આઠ C) નવ D) બાર

296. અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે?
A) ન્હાનાલાલ B) ઈન્દુલાલ યાજ્ઞિક
C) રા.વિ.પાઠક D) રમણભાઈ નીલકંઠ

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

297. ગુજરાતનું ક્યું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ?
A) વડોદરા B) ગોંડલ C) ભાવનગર D) જૂનાગઢ

298. ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા?
A) વલ્લભભાઈ પટેલ B) મોહનલાલ પંડ્યા
C) ગાંધીજી D) વિઠ્ઠલભાઈ પટેલ

299. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?
A) ખેડૂતોનું દેવું માફ કરવા B) મહેસૂલ માફ કરવા
C) અનાજ ઉપરની જકાત માફ કરવા
D) ખેતમજૂરોને પૂરેતા નાણાં અપાવવા

300. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?
A) ભૃગુપુર B) સ્તંભતીર્થ C) દધીપ્રદ્ર D) ભૃગુકચ્છ

301. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા ક્યા જિલ્લામાં આવેલું છે?
A) સુરત B) નવસારી C) તાપી D) જૂનાગઢ

302. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ?
A) માંડવી, કચ્છ B) ભુજ C) ભચાઉ D) ગાંધીધામ

303. ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ?
A) 200 B) 150 C) 170 D) 132

304. મહાગુજરાતના આંદોલનનો ક્યા વર્ષથી આરંભ થયો ?
A) 1953 B) 1956 C) 1958 D) 1952

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

305. ર.વ.દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?
A) દિવ્યચક્ષુ B) ભારેલો અગ્નિ C) ગ્રામલક્ષ્મી D) ઝંઝાવાત

306. ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે ક્યા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?
A) સરદાર પટેલ B) રતુભાઈ અદાણી
C) કનૈયાલાલ મુનશી D) જામસાહેબ

307. 'આંખ આ ધન્ય છે' કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.
A) નરેન્દ્ર મોદી B) વિનોદ જોશી
C) રાજેન્દ્ર શુક્લ D) હર્ષ બ્રહ્મભટ્ટ

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

308. ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યા આવ્યો ?
A) ગાંધીનગર B) દાંડી C) કોચરબ D) અમદાવાદ

309. 'ગુજરાત' શબ્દ ક્યા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?
A) ગુર્જરભૂમિ B) ગુર્જરપ્રદેશ C) ગુર્જરત્રા D) ગુર્જરદેશ

310. 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ?
A) ન્હાનાલાલ B) ગાંધીજી
C) ગોવર્ધનરામ ત્રિપાઠી D) કનૈયાલાલ મુનશી

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

311. ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?
A) છબીલદાસ મહેતા B) કેશુભાઈ પટેલ
C) આનંદીબહેન પટેલ D) ચીમનભાઈ પટેલ

312. 'અભય ઘાટ' ક્યા મહાપુરુષની સમાધિ છે ?
A) મોરારજી દેસાઈ B) રાજીવ ગાંધી
C) ઈન્દિરા ગાંધી D) જવાહરલાલ નેહરૂ

313. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
A) રુદ્રમહાલય-મૂળરાજ સોલંકી B) ભદ્રનો કિલ્લો- એહમદશાહ
C) કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી D) ડભોઈનો કિલ્લો-ચૌલાદેવી

314. ક્યા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂંટ્યું હતું?
A) કર્ણદેવ સોલંકી B) કરણ વાઘેલા
C) ભીમદેવ પહેલો D) મૂળરાજ પહેલો

292)A, 293)D, 294)A, 295)C, 296)B, 297)D, 298)C, 299)B, 300)D, 301)C, 302)A, 303)D, 304)B, 305)B, 306)A, 307)A, 308)D, 309)C, 310)B, 311)D, 312)A, 313)D, 314)C.

315. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
A) હરકુંવર શેઠાણી B) ઈન્દુમતિબહેન શેઠ
C) આનંદીબેન પટેલ D) સ્મૃતિ ઈરાની

316. 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ?
A) ઈ.સ.1930 B) ઈ.સ.1928 C) ઈ.સ.1929 D) ઈ.સ.1922

317. કવિ અખાએ ક્યા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ?
A) ઔરંગઝેબ B) જહાંગીર C) અકબર D) હુમાયુ

318. ક્યો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભુષણ' માનતો હતો ?
A) બહાદુરશાહ ઝફર B) ઔરંગઝેબ
C) અકબર D) જહાંગીર

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

319. ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ?
A) સુરત B) નવસારી C) વલસાડ D) ભરૂચ

320. ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું ?
A) સિદ્ધરાજ જયસિંહ B) મૂળરાજ સોલંકી
C) મહારાજા સયાજીરાવ ગાયકવાડ D) જયદેવ

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

321. સરદાર વલ્લભાઈ પટેલે ક્યા સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું? - બારડોલી

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

322. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યા નામે જાણીતું છે? - કીર્તિ મંદિર

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

323. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? - મીનળ દેવી
324. રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? - ઉદયમતી
325. ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? - ચાર
326. કોણે દાંડીકૂચને 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવી છે ? - મહાદેવભાઈ દેસાઈએ
327. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? - શ્રી મહેંદી નવાઝ જંગ
328. ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહન ભોજન યોજના' ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? - માધવસિંહ સોલંકી
329. 'જ્યોતિપૂંજ' પુસ્તકના લેખક કોણ છે ? - નરેન્દ્ર મોદી
330. તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? - મહેસાણા
331. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? - મહાત્મા ગાંધી
332. બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા ક્યા નામે પ્રચલિત હતા ? - કોરી

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

333. મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? - પુરુષોત્તમદાસ
334. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી ક્યા રાજાના હાથમાં આવી ? - કુમારપાળ
335. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ.........છે. - શ્રીમતિ આનંદીબેન પટેલ
336. પારસીઓ ગુજરાતમાં ક્યા બંદરે ઉતર્યા હતા ? - સંજાણ

મહેસૂલી તલાટી - 2014

337. ભારતના કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતનાં કેટલા રાજ્યો હતા ? - 366
338. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? - ઈ.સ. 1915
339. ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા ક્યા શાસકોએ શિલાલેખ કોતરાવેલા છે ? - રૂદ્રદામા અને સ્કંદગુપ્ત
340. ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે? - કચ્છ

TET- II - ભાષા - 2014

341. ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર છે..... - સા વિદ્યા યા વિમુક્તયે
342. ક્યો રાજવી 'ગુજરાતનો અશોક' કહેવાય છે ? - કુમારપાળ

TET- II - ભાષા - 2015

343. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ? - અમદાવાદ મિલ સત્યાગ્રહ

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

344. મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં ક્યા રાજાનું શાસન હતું ? - ભીમદેવ પ્રથમ
345. લોથલની શોધ કોણે કરી હતી ? - ડૉ.એસ.આર.રાવ
346. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ? - ભરૂચ

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

347. ગુજરાત માટે 'ગુર્જર દેશ' એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ? - મૂળરાજ પ્રથમ
348. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? - ચાંગદેવ
349. મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ? - અણહિલપુર પાટણ

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર કલાર્ક - 2012

350. ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ? - મુઝફ્ફરશાહ બીજો

315)B, 316)B, 317)B, 318)B, 319)B, 320)C.

351. ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ? - **મહમૂદ બેગડો**

352. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? - **મહેંદી નવાઝ જંગ**

353. મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી ? - **ઈન્દુલાલ યાજ્ઞિક**

જૂનિયર ક્લાર્ક પેપર - 1 - 2012

354. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે ? - **નરેન્દ્ર મોદી**

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

355. ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં ? - **શ્રી બાબુભાઈ પટેલ**

356. વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતાં ? - **સર પ્રતાપસિંહ**

357. ક્યાં રાજ્યપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું ? - **માનનીય શ્રી કે.કે. વિશ્વનાથન**

358. નવનિર્માણ આંદોલન ક્યાં હેતુ માટે થયું હતું ? - **મોંઘવારી હટાવવી**

359. ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરુઆત ક્યાં મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થયું ? - **શ્રી.હિતેન્દ્રભાઈ દેસાઈ**

360. ગુજરાત રાજ્યની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષપદે ક્યાં મહાનુભાવ હતાં ? - **શ્રી કલ્યાણજી મહેતા**

361. ગોળીઓ પર કોઈના નામ-સરનામાં હોતા નથી. આ વાક્ય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું ? - **ઠાકોરભાઈ દેસાઈ**

362. ગુજરાતની પંચામૃત યોજનાઓની પાંચ શક્તિ એટલે - **જળશક્તિ, ઉર્જાશક્તિ, જ્ઞાનશક્તિ, કૃષિશક્તિ અને રક્ષાશક્તિ**

363. ઈ.સ. 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? - **અંબાલાલ સાકરલાલ દેસાઈ**

364. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલુ સીલ શેનાં બનેલાં છે ? - **પકવેલી માટી**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

365. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ ક્યા સ્થળે રચવામાં આવ્યું હતું ? - **સાબરમતી આશ્રમ**

366. મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી ? - **સિવિલ હોસ્પિટલ, અમદાવાદ**

367. ઈ.સ. 1956ના વર્ષનું ગુજરાત સંદર્ભે મહત્વ ક્યાં કારણે ગણાય ? - **આ વર્ષે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી**

368. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતાં ? - **ભાઈકાકા**

369. 1956, બીજી ઓક્ટોબરે ઈન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી ? - **જવાહરલાલ નહેરુ**

370. મહાગુજરાત ચળવળ માટે શું સાચું છે? - **આંદોલનનું નેતૃત્વ મહાગુજરાત જનતા પરિષદે લીધું, ગોળીબાર તપાસ માટે નાગરિક તપાસ પંચ નિમાયું, મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણ હતાં**

371. રાષ્ટ્રીય ચેતનાં લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ગુજરાત રાજકીય પરિષદ (ગુજરાત સભા)ની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ ? - **સને 1884-અમદાવાદ**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

372. નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતમાં મુખ્યમંત્રી પદે કોણ હતા ? - **ચીમનભાઈ પટેલ**

373. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન ક્યા યુદ્ધકાળ-વર્ષ દરમિયાન થયેલ હતું? - **સને-1965**

374. ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન..........સાલમાં લદાયું. - **ઈ.સ. 1971**

375. સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાતાં ક્યા દિવસે અમદાવાદની લૉ કૉલેજમાં વિદ્યાર્થીઓની સભામાં 'પગલાં સમિતિ'ની રચના કરવામાં આવી હતી ? - **7 ઓગસ્ટ - 1956**

376. કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ સને-1959માં 'ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી' એવો અભિપ્રાય કોણે આપ્યો હતો ? - **યશવંતરાવ ચવાણ**

377. ગુજરાતમાં ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળમાં 'ગોકુળ ગ્રામ યોજના' અમલમાં મૂકાયેલ હતી? - **કેશુભાઈ પટેલ**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

378. નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના ક્યા વીર સપુતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?- **શ્યામજીકૃષ્ણ વર્મા**

379. ગુજરાતના ક્યા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી ? - **વડનગર**

380. 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ? - **સુભાષચંદ્ર બોઝ**

381. વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિરૂપે ક્યુ નગર વસાવવામાં આવ્યું ? - **ચાંપાનેર**

382. ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ? - **ચંદુલાલ ત્રિવેદી**

383. ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતાં ? - **કલ્યાણજી મહેતા**

384. ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ પાટનગર જણાવો. - **અમદાવાદ**

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

385. એક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે તેમને પગમાં તીર વાગતા તેમણે દેહત્યાગ કર્યો હતો. આ વૃક્ષ જે સ્થળે આવેલ છે તે 'ભાલકા તીર્થ' ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **ગીર સોમનાથ**

386. ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો ? - **માધવસિંહ સોલંકી**

TET- I - 2012/2014

387. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યા થયો હતો ? - **પાલનપુર**
388. ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો ? - **12મી માર્ચ 1930 અને 78 સત્યાગ્રહીઓ**
389. ગુજરાતના ક્યા ક્રાંતિવીર 'ડુંગળીચોર' તરીકે જાણીતા છે ? - **મોહનલાલ પંડ્યા**

સબ ઑડિટર - 2015

390. સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? - **મહારાજા તખ્તસિંહજી**

સબરજિસ્ટ્રાર - 2013

391. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષમાં થઈ? - **ઈ.સ. 1920**
392. "મહાગુજરાતની ચળવળ" ક્યા વર્ષમાં કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ ? - **1956 - ઈન્દુલાલ યાજ્ઞિક**

HTAT - 2012

393. ડો. જીવરાજ મહેતા - **તેમનો જન્મ અમરેલી જિલ્લામાં થયેલ હતો, તેઓ ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા**
394. બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યાં આશ્રમેથી સરદાર પટેલે કરેલું ? - **સ્વરાજ આશ્રમ**
395. મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોણ કર્યું હતું? - **ઈન્દુલાલ યાજ્ઞિક**

PSI - 2012

396. ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? - **1963**
397. નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે આ કહેલું : Half Naked Seditious Fakir ? - **ચર્ચીલ**

PSI નશાબંધી - 2011

398. શ્રી અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે ક્યા સામાયિકમાં છપાયેલી ? - **સાવિત્રી**

એકાઉન્ટ ઓફિસર - 1999

399. સિદ્ધરાજ જયસિંહને ક્યા ઉપનામથી બોલાવતા ? - **અવંતિનાથ, બર્બરક જિષ્ણુ, ત્રિભુવનરાજ, સિદ્ધચક્રવર્તી**
400. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે સિંહભાગ ભજવ્યો ? - **સરદાર વલ્લભભાઈ પટેલ**

ચીફ ઓફિસર - 1999

401. ભારતીય સ્વરાજની લડાઈમાં 1930નું વર્ષ મહત્વનું છે - **દાંડીકૂચ**
402. ગુજરાત રાજ્યનું ઉદ્‌ઘાટન કોના હસ્તે થયું હતું ? - **રવિશંકર મહારાજ**

મેડિકલ ટ્યૂટર - 2000

403. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યા આવેલો છે ? - **ગિરનારની તળેટીમાં**

વૈદકિય સેવા - 2000

404. વલ્લભભાઈ પટેલને ક્યા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું ? - **બારડોલી સત્યાગ્રહ**
405. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા આવેલો છે ? - **ગિરનારની તળેટી**

TET-II -2017

406. વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે ઘોષિત થયેલ અમદાવાદ શહેરમાં નેશનલ મોન્યૂમેન્ટ્સ કેટલા છે ? - **54**
407. ક્યુ કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર છે ? - **અતિવૃષ્ટિ છતા મહેસૂલ ઉઘરાવવાનું**
408. ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યા રાજાએ કરી ? - **ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી**
409. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? - **ઈ.સ.1960**
410. ભારતના ચાર ધામમાંથી એક છું, છ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે. મને ઓળખો. - **દ્વારકાધીશ મંદિર**

HTAT - 2015

411. ફતેહપુર સિક્રીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ? : **અકબર**
412. અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ? : **હિંદ છોડો**

એકાઉન્ટ એન્ડ ઑડિટર - 2016

413. ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત્ થઈ ? - **બળવંતરાય મહેતા**
414. ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? - **ડૉ.જીવરાજ મહેતા**

કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર - 2012

415. આઈ. આઈ. એમ. અમદાવાદની સ્થાપનામાં ક્યા મુખ્યમંત્રીશ્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે ? - **ડો.જીવરાજ મહેતા**
416. 1960માં ગુજરાત રાજયની સ્થાપના બાદ ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કઈ સાલમાં બની હતી ? - **1965**
417. મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરી ? - **સપ્ટેમ્બર - 1956**
418. ગુજરાતમાં સહુ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન ક્યા વર્ષમાં લદાયું હતું ? - **1971**
419. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી ? - **1960**

પોલીસ કોન્સ્ટેબલ - 2012

420. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે? - **જુનાગઢ**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

421. ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈ-વે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે? : **નરેન્દ્ર મોદી**
422. ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા? : **સંજાણ**
423. ગુજરાતના ક્યા દેશી રજવાડા માટે આરઝી હકુમત રચાઈ હતી? : **જૂનાગઢ**
424. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? : **ગાંધીજી**
425. શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ક્યા મંત્રી રહી ચૂકેલા છે ? : **કાપડ મંત્રાલય**
426. સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? : **ભાઈકાકા**
427. કાદંબરીના રચયિતા કોણ છે? : **બાણભટ્ટ**
428. હિન્દીના દાદાનું બિરુદ કોને મળે ? : **દાદાભાઈ નવરોજી (ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા)**
429. હિન્દ સ્વરાજના લેખક કોણ છે? : **ગાંધીજી**
430. 8 ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું ? : **હિંદ છોડો આંદોલન**
431. મહાત્મા ગાંધીએ ક્યા વર્ષે દાંડીકૂચ કરી ? : **1930**
432. સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ .... સ્થળે સ્વીકૃત થયો હતો. - **રોજડી**
433. ગુજરાતનો દસ્તાવેજી ઈતિહાસ ક્યા સમયગાળાથી શરૂ થાય છે? : **મૌર્યકાળ**
434. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ? : **પુષ્યગુપ્ત વૈશ્ય**
435. મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી ? : **ઈ.સ. 1026**
436. અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ? : **કર્ણાવતી**
437. રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે? : **સિદ્ધપુર**
438. નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને શું બનવાની શીખ આપી ? : **કર્મયોગી**
439. શ્રીકૃષ્ણને ક્યા સ્થળે તીર વાગ્યું ? : **ભાલકાતીર્થ**
440. 1857ના વિપ્લવ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવનાર ક્યો નેતા ગુજરાતમાં આવ્યો હતો? : **તાત્યા ટોપે**
441. ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? : **ગાંધીજી**
442. તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું ? : **રામચંદ્ર પાંડુરંગ ટોપે**
443. ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી ક્યા વિષયના અનુસ્નાતક છે ? : **રાજ્યશાસ્ત્ર**
444. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ક્યો છે? : **ખેડા સત્યાગ્રહ**
445. દાંડીકૂચની તારીખ કઈ હતી ? : **12મી માર્ચ**
446. અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી? : **ઈ.સ. 1613**
447. મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર ક્યું હતું? : **વલભી**
448. સલ્તનતયુગીન ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર ક્યું હતું ? : **ખંભાત**
449. ક્યા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા ? : **અરવિંદ ઘોષ**
450. જામનગર જિલ્લાનું ગોપમંદિર .... દ્વારા બંધાયું હતું ? - **મૈત્રક**
451. ગુજરાત રાજયના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો. - **જીવરાજ મહેતા**
452. ક્યા સત્યાગ્રહ દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ ? - **ખેડા સત્યાગ્રહ**
453. ગુજરાત રાજય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? - **દાંડી યાત્રા**
454. આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે સક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ? - **શેઠ અંબાલાલ**
455. મહાગુજરાત આંદોલનના પરિણામે.......... **મુંબઈ રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજીત થયું.**
456. 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ? - **સુભાષચંદ્ર બોઝ**
457. સરદાર વલ્લભભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? - **ઈ.સ.1928**
458. ઈ.સ.1020થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા? - **વિશળદેવ ચૌહાણ**
459. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી .... ના પ્રદાન સારુ કરવામાં આવે છે. - **ભારતીય વિકાસમાં વિદેશી ભારતીય સમુદાય**
460. ક્યા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું ? - **ઈ.સ.1304**
461. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? - **મહાદેવભાઈ દેસાઈ**
462. પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **અમદાવાદ**
463. પ્રાચીન ગુજરાતનો ક્યો રાજા 'એકાંગવીર' કહેવાતો ? - **ભીમદેવ બીજો**
464. કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યા છે ? - **આગાખાન મહેલમાં**
465. ક્યા સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના સંબંધોની શરૂઆત થઈ ? - **ખેડા સત્યાગ્રહ**
466. કુતુબુદીન ઐબકે બે વાર ગુજરાત ઉપર ચડાઈ કરીને પાટણ લૂંટ્યું હતું ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારી હતી? - **લવણપ્રસાદ**
467. ગુજરાતના વલભીપુરમાં મૈત્રક રાજા વીરસેનના રાજ્યાશ્રયમાં સંસ્કૃત ભાષાના ક્યા કવિએ મહાકાવ્યની રચના કરેલી ? - **માઘ**
468. સલ્તનતયુગના ગુજરાતમાં સૌથી વધુ સમૃદ્ધ બંદર ક્યું હતું ? - **ખંભાત**
469. મહાત્મા ગાંધી કેટલીવાર ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ? - **એકવાર**
470. ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા ક્યા શહેરમાં ક્યારે શરૂ થઈ હતી ? - **સુરત-1842**
471. ગુપ્તશાસનના પતન બાદ ગુજરાતમાં ક્યો વંશ સત્તામાં આવ્યો? - **મૈત્રક વંશ**
472. સોલંકી કાળમાં ગુજરાતમાં ક્યો ધર્મ અસ્ત પામ્યો ? - **બૌદ્ધ**
473. અલાઉદ્દીન ખલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ? - **કાન્હડે પ્રબંધ**

474. ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ....માં આવેલું છે. - **અનહિલવાડ પાટણ**

475. ડભોઈ કિલ્લો......ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. - **સિદ્ધરાજ જયસિંહ**

476. ક્યા રાજાએ ભીલ બર્બરકને નિયંત્રિત કરી બર્બરક જિષ્ણુ ખિતાબ અલંકૃત કર્યો ? - **સિદ્ધરાજ જયસિંહ**

477. રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રીગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? - **વિજાપુર**

478. ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યા વંશના હતા ? - **ચાલુક્ય**

479. સત્યાગ્રહના લડવૈયા પૂ.રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. - **ખેડા**

480. વસ્તુપાલ-તેજપાલનું નામ ક્યા રાજવી સાથે જોડાયેલ છે ? - **રાણા વીરધવલ**

481. સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ? - **અંબાલાલ સાકરલાલ દેસાઈ**

482. ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો. - **શ્યામજી કૃષ્ણ વર્મા**

483. 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત ....માંથી બનેલી છે. - **આરસ**

484. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ? - **અહમદશાહ**

485. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ? - **અલાઉદ્દીન ખીલજી**

486. મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - **પાટણ**

487. જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો. - **રાયચંદભાઈ**

488. ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યા થઈ હતી ? - **સોનગઢ**

489. અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે ? - **મહંમદ બેગડો**

490. પૌરાણિક નવલખા મંદિરનું સ્થાનક ધુમલી ક્યા જિલ્લામાં આવેલું છે ? - **દેવભૂમિ દ્વારકા**

491. પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યા બંદરે ઉતરેલ હતા ? - **સંજાણ**

492. અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષોની જાણકારી મેળવી તેમણે ક્યા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? - **1912**

493. અહમદશાહે અમદાવાદ વસાવ્યું અને ઘણા સ્થાપત્યોનું નિર્માણ કર્યું. આ ઘટના ક્યારે બની હતી ? - **15મી સદીમાં**

494. 'એક નહીં અગિયાર મોરારજીભાઈ અને બાવીસ જવાહરલાલ નેહરુ આવે તો પણ મહાગુજરાત આવતું રોકી શકશે નહીં'... મહાગુજરાત આંદોલન સમયે આ ઉક્તિ કોની ? - **જયંતી દલાલ**

495. ચાંપાનેરી મસ્જિદ કઈ શૈલીના મિશ્રણથી બંધાયેલું સ્મારક છે ? - **હિન્દુ-મુસ્લિમ સ્થાપત્ય શૈલી**

496. ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ 'વોકર સેટલમેન્ટ' શાને લગતું હતું ? - **ખંડણીની રકમ**

497. અમદાવાદનો કબજો કંપની સરકારે ક્યા વર્ષમાં લીધો હતો ? - **ઈ.સ.1857**

498. સાબરમતી આશ્રમ વર્ષ ....માં બંધાયો. - **1917**

499. મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને 'ફરઝંદે ખાસ દોલત ઈંગ્લિશિયા'નો ઈલ્કાબ આપ્યો હતો ? - **સયાજીરાવ ત્રીજા**

500. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ? - **પાટણ**

501. સન 1948માં 'સૌરાષ્ટ્ર' રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ? - **જામસાહેબ દિગ્વિજયસિંહ**

502. ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા ? - **ખેડા સત્યાગ્રહ**

503. જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ? - **ભગવાનલાલ ઈન્દ્રજી**

504. અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા. - **ઉલુઘખાન, નુસરતખાન**

505. ક્યા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો ? - **ઈ.સ. 1979**

506. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી ? - **24 દિવસ**

507. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. - **શ્રીમદ્ રાજચંદ્ર**

508. ગુજરાતના ક્યા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો ? - **સિદ્ધરાજ**

509. છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ? - **ડૉ. ચંદુલાલ દેસાઈ**

510. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવી હતી ? - **તખ્તસિંહજી**

511. મધ્યકાલીન ગુજરાતમાં 'ગરાશીયા' શબ્દનો સંદર્ભ...... છે. - **રાજપૂત રાજવી પરિવારના નાના સભ્યોને આપવામાં આવેલ જમીનો અને ગામોના વારસાગત ધારણકર્તા.**

512. પુરાતત્વીય પુરાવા અનુસાર ક્યું સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે ? - **લોથલ**

513. ગિરનાર વિસ્તારમાં સુદર્શન તળાવના ઢોળાવના બાંધકામ માટે અશોકનો અધિકારી કોણ હતા ? - **તુષાષ્ફ**

514. ક્યો પ્રથમ શિલાલેખ છે જે વાપીને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે ? - **રુદ્રસિંહ પથ્થર શિલાલેખ**

515. ઈ.સ.1026માં જ્યારે ગઝનીના મહંમદે સોમનાથ લૂંટ્યું ત્યારે અણહીલવાડ રાજ્યનો રાજા કોણ હતો ? - **ભીમ-પ્રથમ**

516. તખ્તસિંહજી દ્વારા ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આ શામળદાસ કોણ હતા ? - **ભાવનગરના દિવાન**

517. યંગ ઈન્ડિયા સાપ્તાહિક સાથે કોનું નામ જોડાયેલું છે ? - **મોહનદાસ ગાંધી**

518. ગુજરાતના રાજવંશોને કાળક્રમ મુજબ જણાવો. - **યાદવ, મૈત્રક, ચાવડા અને સોલંકી**

519. ક્યા સ્થળને ભારતના પશ્ચિમ કાંઠાનું વેપાર ભંડાર તરીકે ઓળખવામાં આવે છે ? - **કૂન્તાસી**

520. ધુમલી........ રાજવંશની રાજધાની હતી. - **જેઠવા**

521. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર.....ખાતે આવેલું. - **અમદાવાદ**

522. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? - **ઈ.સ.1949**

523. પ્રથમ ક્ષત્રપ રાજા કોણ હતો - **ચષ્ટન**

524. સમ્રાટ અશોકનો 14મો ખડક આદેશ ક્યા સ્થળે આવેલો છે ? - **જૂનાગઢ**

525. સાબરકાંઠા જિલ્લામાં .... તામ્ર પાષાણ યુગનું ખડકચિત્રનું સ્થળ છે. - **ઈડર**

526. ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે 'પાંચમું પગાર પંચ' ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલ ? - **દિલીપ પરીખ**

527. સુખી ખીણમાં અમ્બાકુટ એ......... સમયનું સ્થળ છે. - **મધ્ય પાષાણકાળ**

528. હેમચંદ્રાચાર્યએ કોની વિનંતિને અનુલક્ષીને અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર વિગેરે તૈયાર કર્યા ? - **સિદ્ધરાજ જયસિંહ**

529. સયાજીરાવ ગાયકવાડ-IIIએ........ને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી. - **ડૉ.બી.આર. આંબેડકર**

530. અભિર ઈશ્વરદેવનો યષ્ટિ ઉપરનો પૂર્વાલેખ ક્યાંથી મળી આવ્યો છે ? - **દોલતપુર**

531. અકબરનો ગુજરાતનો સુબેદાર કોણ હતો ? - **મીર્ઝા અઝીઝ કોકા**

532. ગુજરાતમાં રાજકોટ કોલેજની સ્થાપના ક્યા અંગ્રેજ વાઈસરોયે કરી હતી ? - **લોર્ડ મેયો**

533. મુંજાલ અને શાંતુ......ના દરબારમાં મંત્રી હતા. -**સિદ્ધરાજ જયસિંહ**

534. 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં કોણે સક્રિય ભૂમિકા ભજવી હતી ? - **મુખી ગરબડદાસ, સુરજમલ, જોધા અને મૂળુ માણેક, રૂપા અને કેવલ નાયક**

535. સત્યાગ્રહોનો યોગ્ય ક્રમ જણાવો. - **ચંપારણ સત્યાગ્રહ, મિલ-કામદારો સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ**

536. ગુજરાતનું ક્યું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે ? - **વલ્લભી**

537. ક્યા સ્થળે અંગ્રેજ સરકાર દ્વારા દેશદ્રોહ માટે સૌપ્રથમ વખત ગાંધીજીની ધરપકડ થઈ હતી ? - **અમદાવાદ**

538. કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? - **મજૂર મહાજન સંઘ**

539. ક્યા સ્થળેથી સિંધુ સંસ્કૃતિની શિંગડાવાળી દેવીની છબીવાળો ઘડો મળી આવ્યો છે ? - **પાદરી**

540. અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા ? - **સુરત**

541. સિંધુખીણની સંસ્કૃતિ સમયના લોથલ બંદર વિશે સાચું જણાવો. - **તેનો વિશાળ ગોદીનો ભાગ પાણીના સ્તરથી ઊંચે હતો.**

542. 'લોથલ' શેના માટે જાણીતું છે ? - **સિંધુ ખીણની સંસ્કૃતિ**

543. જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે ક્યા વંશનું શાસન હતું ? - **બાબી વંશ**

544. આપણા દેશમાં 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? - **2003**

545. ભગવદગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ ક્યા રાજ્યના રાજવી હતા ? - **ગોંડલ**

546. કંથકોટ કિલ્લાનું સૂર્યમંદિર ....ના સમયમાં બંધાયેલું છે. - **વાઘેલા વંશ**

547. દેવની મોરી સ્તુપ........ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો ? - **રૂદ્રસેન**

548. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત ક્યા ચીની મુસાફરે લીધી હતી ? - **હ્યુ એન ત્સાંગ**

549. ક્યા હડપ્પીય સ્થળમાંથી ઈ.સ.પૂર્વે 5000ના સોનાના અલંકારો મળ્યા છે ? - **લોથલ**

550. વડોદરા રિયાસત દ્વારા ક્યા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી ? - **ઈ.સ.1906**

551. દેલવાડાના દેરાઓ કોણે બંધાવ્યા હતા ? - **વસ્તુપાળ-તેજપાળ**

552. વલ્લભભાઈ પટેલ 'સરદાર' ક્યારથી કહેવાયા ? - **બારડોલી સત્યાગ્રહ**

553. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે પણ........તરીકે ઓળખાય છે. - **ન્યાય સરોવર**

554. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યા આવેલો છે ? - **નેનપુર**

555. મૈત્રકકાળમાં વલભીપુરની જાહોજલાલી હતી. ઈ.સ.788માં સિંધના હાકેમ હિશામે વલભીપુર પર હુમલો કર્યો નગરનલે લૂંટ્યું. નિર્દોષ પ્રજાની કત્લ કરી અને વલભીનો રાજા મરાયો. આ રાજા કોણ હતો ? - **શીલાદિત્ય સાતમો**

556. 'દિન ખૂને કે હમારે પ્યારે ન ભૂલ જાના' લખાણવાળી સ્વાતંત્ર્યની લડતના શહીદ વીર સપૂતની ખાંભી કોની છે ? : **વિનોદ કિનારીવાલા**

557. આચાર્ય હેમચંદ્રાચાર્યના નિવાસે નિતનવું સાહિત્ય લખાતું, વ્યાકરણ લખ્યું, વ્યાકરણના મૂળ સૂત્રો, વૃત્તિ અને વિવેચન તૈયાર થયા. હાથી પર આદરપૂર્વક પધરાવી આખા પાટણ નગરમા વાજતે-ગાજતે વરઘોડો કાઢ્યો અને પોતે પણ પગે ચાલીને એ યાત્રામાં જોડાયા તે વખતે પાટણના શાસક કોણ હતા ? : **સિદ્ધરાજ જયસિંહ**

558. ભારતના સૌથી પ્રાચીન બંદર તરીકે કોની ગણના થાય છે ? - **લોથલ**

559. ગુજરાતની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? - **અહમદશાહ પ્રથમ**

560. અમદાવાદ શહેરમાં કોણે હોસ્પિટલ બંધાવી હતી જે વિસ્તરીને આજે સિવિલ હોસ્પિટલ થઈ છે ? : **હરકુંવર શેઠાણી અને પ્રેમાભાઈ નગરશેઠ.**

561. બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી ક્યા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? : **1893**

562. ગુજરાતનું સમૃદ્ધિથી સભર સોમનાથનું મંદિર લૂંટને કારણે વિશ્વપ્રસિદ્ધ બન્યું, એક હજાર વર્ષ પહેલાં આક્રમણ કરીને ફરી ફરીને આ મંદિરમાં લૂંટ કરી હતી ? : **મહંમદ ગઝનવીએ**

563. દાંડીયાત્રા દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા. આ ટુકડી ક્યા નામે ઓળખાતી ? : **અરૂણ ટુકડી**

564. વલભીનો રાજ્યધર્મ .... હતો. - **શિવવાદ**

565. ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? : **14મી**

566. .... ગુજરાતનો 'સુવર્ણ યુગ' ગણાય છે. - **સોલંકી યુગ**

567. ક્યા રાજવીના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરીને લૂંટ ચલાવી હતી ? - **ભીમદેવ પહેલો**

568. પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ..... ભાષામાં છે. - **ગુજરાતી**

569. જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી તેને ..... કહે છે. - **ખીરક**

570. ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ? - **ઉત્તરીય કાળી પોલીશના વાસણો**

571. મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી-કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ? : **5 એપ્રિલ**

572. ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા? - **1888**

573. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? - **અસહકાર આંદોલન**

574. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ? - **શંકરલાલ પરીખ**

575. ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો. - **આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન**

576. સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ? - **સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી**

577. ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં ક્યું નામ સૌથી વધુ જાણીતું છે ? - **ડૉ.હસમુખ સાંકળીયા**

578. સુલતાન અહમદશાહે ગુજરાતમાં 'વાંટાની પ્રથા' દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ? - **જમીન**

579. ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ? : **કર્ણદેવ વાઘેલા**

580. પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો - **બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા**

581. ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ? - **પુલકેશી**

582. ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ? - **લાંઘણજ**

583. ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ? - **પોર્ટુગીઝ**

584. ઈજિપ્તિયન મમીની મૃણ્મૂર્તિ પ્રતિકૃતિ......થી મળી આવી હતી. - **લોથલ**

ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ?
A) વેરાવળ B) દ્વારકા C) દેવની મોરી D) વલસાડ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

2. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?
A) 4 B) 7 C) 5 D) 3

3. ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.
A) પ્રસિદ્ધ ગાયક B) વૈજ્ઞાનિક
C) લેખક -પત્રકાર D) રંગભૂમિના કલાકાર

4. ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યુ?
A) શામળદાસ ગાંધી B) ઈન્દુલાલ યાજ્ઞિક
C) ઝવેરચંદ મેઘાણી D) ઉમાશંકર જોશી

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

5. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ?
A) વેચાણ ઘર B) હાટ
C) કલા પ્રદર્શન D) હાથશાળ મેળો

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

6. પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો.
A) તલગાજરડા B) ભાવનગર C) મહુવા D) બોટાદ

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

7. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું ?
A) અંધીર-ઉજાસ B) પ્રકાશકિરણ
C) પ્રકાશનો પડછાયો D) પ્રકાશ પુંજ

8. ગુજરાતનું ક્યું શહેર 'સાક્ષરભૂમિ' તરીકે ઓળખાયેલું છે ?
A) ખેડા B) વડોદરા C) નડિયાદ D) આણંદ

9. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું ક્યું છે ?
A) સત્યના પ્રયોગો B) નીતિવાદને માર્ગે
C) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
D) હિન્દ સ્વરાજ

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

10. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ?
A) ગાંધાર B) જંબુસર C) દહેજ D) ભાડભૂત

11. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે ?
A) મેરાયો નૃત્ય B) મરચી નૃત્ય
C) ટિપ્પણી નૃત્ય D) ગોફ ગૂંથણ નૃત્ય

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

12. ગુજરાતના ક્યા શહેરની 'બાંધણી' સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે ?
A) ભાવનગર B) ભૂજ C) જામનગર D) જૂનાગઢ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

13. ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?
A) સ્વામી દયાનંદ B) સ્વામી વિવેકાનંદ
C) સ્વામી સચ્ચિદાનંદ D) સ્વામી સરસ્વતીચંદ્ર

14. નીચેનામાંથી ગુજરાતનું ક્યું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?
A) ગીર અભયારણ્ય B) ચાંપાનેર
C) સૂર્યમંદિર, મોઢેરા D) દ્વારકા મંદિર

15. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે ?
A) સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
B) ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
C) એમ.જે.લાઈબ્રેરી, અમદાવાદ
D) યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર

GPSC પેપર - 1 - 2017

16. સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ-ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?
A) ડાંગ જિલ્લામાં B) દાહોદ જિલ્લામાં
C) વલસાડ જિલ્લામાં D) પંચમહાલ જિલ્લામાં

17. 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ?
A) મીના B) ગરાસીયા C) રાઠવા D) ધોડિયા

1)C, 2)B, 3)C, 4)B, 5)B, 6)A, 7)C, 8)C, 9)A, 10)D, 11)A, 12)C, 13)C, 14)B, 15)A, 16)B, 17)C.

18. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?
A) રોમન B) મુઘલ C) ચાલુક્ય D) ઈન્ડો-આર્યન

19. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?
A) ગૌડિયા પ્રણાલી B) રસિક પ્રણાલી
C) વારકરી પ્રણાલી D) સખી પ્રણાલી

20. 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ?
A) ખોડીદાસ પરમાર B) છગનભાઈ જાદવ
C) વાસુદેવ સ્માર્ત D) કાન્તિભાઈ પરમાર

21. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં ?
A) નવધા ભક્તિ B) મધુરા ભક્તિ
C) પંચસખા D) સહજ

22. 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ?
A) દિવાળીબાઈ B) ગૌરીબાઈ C) ક્રિષ્ણાબાઈ D) રાધાબાઈ

23 ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ?
A) ક્ષત્રિય B) સોમપુરા C) ભીલ D) વૈશ્ય

24. ગુજરાતનાં કયા શૈક્ષણિક સંકુલ / સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ?
A) ગુજરાત યુનિવર્સિટી B) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
C) ગોવિંદગુરુ યુનિવર્સિટી D) ગુજરાત વિદ્યાપીઠ

25. જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?
A) નૃસિંહ વિભાકર B) ફુલચંદ શાહ
C) મણિશંકર ભટ્ટ D) ડાહ્યાભાઈ ધોળશાજી

26. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
A) રાજકોટ B) વડોદરા C) પોરબંદર D) પાટણ

27. બન્ને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.
1) રણછોડભાઈ ઉદયરામ 'રણછોડ આમલીખાઉ' તરીકે જાણીતા છે.
2) 'લક્ષ્મી વિજય ડ્રામા ગ્રુપ'ના સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે.
A) 1 સાચું અને 2 ખોટું છે B) 1 અને 2 બંને સાચાં છે
C) 1 અને 2 બંને ખોટાં છે D) 1 ખોટું છે અને 2 સાચું છે

28. યાદી - I અને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

યાદી - I	યાદી - II
1) અપ્પારાવ ભોલાનાથ લાયબ્રેરી	A) રાજકોટ
2) બૈંશ લાયબ્રેરી	B) ભાવનગર
3) રાયચંદ દિપચંદ લાયબ્રેરી	C) અમદાવાદ
4) બાર્ટન લાયબ્રેરી	D) ભરૂચ

Codes :
A) 1-a, 2-b, 3-d, 4-c B) 1-c, 2-a, 3-d, 4-b
C) 1-b, 2-a, 3-c, 4-d D) 1-d, 2-b, 3-c, 4-a

29. ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે ?
A) મેર રાસ B) ગરબા C) ટિપ્પણી D) ઘુમ્મર

30. 'અજરખ' છાપકામ શેના ઉપર થાય છે ?
A) કાપડ B) સીરામીક
C) ટેરાકોટા D) ધાતુના બીબાકામ

31. આઈ.આઈ.એમ. અમદાવાદ આર્કિટેક્ટ
A) ચાર્લ્સ કોરીયા (Charles Correa)
B) લુઈસ કહાન (Louis Kahan (Louis Kahn))
C) હાફિઝ કોન્ટ્રાક્ટર (Hafiz Contractor)
D) ફ્રેંક ગહરી (Frank Gehry)

32. "જનતા વોચ" કોને દોરી હતી ?
A) ગુલામ મહંમદ શેખ B) ભૂપેન ખખ્ખર
C) જેરામ પટેલ D) નસરીન મોહમદી

33. કચ્છ ભિંતચિત્ર કહેવાય .... છે.
A) અસુરનીસીરપાલ B) કામણગારી
C) મેનેસ D) અસુરબનીપાલ

34. વિતર્નચિત્ર એટલે
A) કપડાં પરનું ચિત્ર B) સીલ્ક સ્ક્રીન (Silk Screen)
C) છત પરનું ચિત્રકામ D) વુડકટ (Woodcut)

GPSC MAINS પેપર - 1 - 2016

35. નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ?
A) ભાવનગર B) સુરેન્દ્રનગર C) જામનગર D) જૂનાગઢ

36. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
A) કંકુ B) તાનારીરી
C) ભવની ભવાઈ D) ઝેર તો પીધા છે જાણી જાણી

37. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળ (Library Movement)ના પ્રણેતા કોણ હતાં ?
A) એલેકઝાંડર કીનલો ફોબર્સ B) ફતેસિંહ ગાયકવાડ
C) રા'ખેંગારજી ત્રીજા D) મોતીભાઈ અમીન

38. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ?
A) દુર્ગારામ મહેતા B) દલપતરામ
C) નર્મદ D) ભોલાનાથ સારાભાઈ

39. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ વિખ્યાત છે ?
A) અંબાલાલ સારાભાઈ B) રણછોડદાસ ગીરધરદાસ
C) લોર્ડ બીશપ કાર D) ટી.સી. હોપ

40. બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે ?
A) વડતાલ B) બોચાસણ C) મણીનગર D) સારંગપુર

41. 'પ્રણામી સંપ્રદાય' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો ?
A) દેવચંદ્ર B) પ્રાણનાથ C) લાલજી D) કુબેરદાસ

18)C, 19)D, 20)A, 21)B, 22)C, 23)B, 24)D, 25)D, 26)A, 27)C, 28)B, 29)B, 30)A, 31)B, 32)B, 33)B, 34)C, 35)B, 36)C, 37)D, 38)A, 39)B, 40)B, 41)A.

42. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ
A) ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની ઉજવણી છે.
B) કૃષ્ણના દ્વારકારની ગાદીએ રાજ્યાભિષેકની ઉજવણી છે.
C) અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.
D) પાંચાલ કુંવરી દ્રૌપદીના સ્વયંવરની યાદગીરી છે.

43. પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું ?
A) દ્વારવતી B) આનર્ત C) લાટ D) સુરાષ્ટ્ર

44. 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યા યોજાય છે ?
A) અંબાજી (બનાસકાંઠા) B) ગુણભાખરી (સાબરકાંઠા)
C) વૌઠા (અમદાવાદ) D) સાગબારા (નર્મદા)

45. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ?
A) દ્વારકાધીશનું મંદિર B) ક્રિષ્ન મંદિર
C) જગત મંદિર D) મુખ્ય મંદિર

46. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે ?
A) ભરૂચ B) ઉદવાડા C) વડોદરા D) અમદાવાદ

47. નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે ?
A) ટિપ્પણી B) ગરબી C) રાસડો D) ટીંટોડો

48. 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?
A) ખોજા B) પારસી C) મેમણ D) યહુદી

49. ક્યા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી ?
A) કાનજી માલમ B) વીરજી માલમ
C) રામસિંહ માલમ D) શ્યામ માલમ

50. કોટવાલની શી ફરજ હતી ?
A) કિલ્લાનું ધ્યાન રાખવું B) કિંમતોનું નિયમન કરવું
C) ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું
D) ઉપરની તમામ

51. 'પિઠોરા' શું છે ?
A) આદિવાસી ચિત્રકળા B) આદિવાસી તહેવાર
C) આદિવાસી નૃત્ય D) આદિવાસી સંગીત

52. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ?
A) 1906 B) 1913 C) 1916 D) 1919

53. ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાજિંત્ર અનિવાર્ય છે ?
A) ભૂંગળ B) કરતાલ C) ઢોલક D) એકતારો

54. ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને કહેવાય છે ?
A) જયા B) વિજયા C) ભદ્રા D) નંદા

55. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ?
A) રાજાઓ B) ધનાઢ્ય વેપારીઓ
C) પુષ્ટી સંપ્રદાયો D) માનભટ્ટો

56. નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે?
A) વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ
B) બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર
C) કચ્છ મ્યુઝીયમ, ભુજ
D) બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા

57. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ?
A) અમદાવાદ B) વડોદરા C) રાજકોટ D) ભાવનગર

58. સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું) ભારતમાં આયાત કર્યું ?
A) વીરજી વોરા B) શાંતિદાસ ઝવેરી
C) ભીમજી પારેખ D) શેઠ ભીક્નદાસ

59. હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન'માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી ?
A) ભાનુ અથૈયા B) મૃણાલિની સારાભાઈ
C) સોનલ માનસિંગ D) કુમુદિની લાખિયા

60. સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક'માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ?
A) નૈપથ્ય B) થોડાં આંસુ થોડાં ફુલ
C) નાટક સરખો નાદર હુન્નર D) કોયલ કાહે શોર મચાયે

GPSC MAINS પેપર - 2 - 2016

61. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?
A) રવિશંકર મહારાજ B) મનુભાઈ પંચોળી 'દર્શક'
C) પરીક્ષિત મજમુદાર D) નાનાભાઈ ભટ્ટ

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

62. 'ઝંડા-ઝુલણ' સાથે કઈ કળા જોડાયેલી છે ?
A) ભરતકામ B) નાટ્ય C) ભવાઈ D) સ્થાપત્ય

63. સાહિત્યકૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?
A) ભાનુ અથૈયા B) સોનલ માનસિંહ
C) સુનીલ કોઠારી D) ડ

64. ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?
A) ભદ્રેશ્વર B) હસ્તગિરી C) પાલિતાણા D) તારંગા

65. મલ્લિકા સારાભાઈ ક્યા નૃત્યના જ્ઞાતા છે ?
A) મોહિની અટ્ટમ B) ભરતનાટ્યમ અને મણિપુરી
C) ભરતનાટ્યમ અને કુચીપુડી D) કથક

66. સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ..... શૈલીનો છે.
A) નાગર શૈલી B) ગોથિક શૈલી
C) તળપદા સ્થાપત્ય D) ઈરાની શૈલી

PSI GK - 1/1/2017

67. તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) બનાસકાંઠા B) પાટણ C) સાબરકાંઠા D) મહેસાણા

42)A, 43)B, 44)B, 45)C, 46)D, 47)B, 48)B, 49)A, 50)D, 51)A, 52)C, 53)A, 54)A, 55)C, 56)C, 57)A, 58)C, 59)D, 60)B, 61)D, 62)C, 63)B, 64)D, 65)C, 66)A, 67)D.

કોન્સ્ટેબલ - 23/10/2016

68. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
A) મહેસાણા B) સાબરકાંઠા C) અમદાવાદ D) ખેડા

કોન્સ્ટેબલ - 2015

69. નીચેનામાંથી ક્યું લોકનૃત્ય ગુજરાતનું નથી ?
A) બિહુ B) મેર રાસ C) ટિપ્પણી D) હૂડો

70. ગોળ ગધેડાનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
A) દાહોદ B) બનાસકાંઠા C) ભરૂચ D) સુરત

બિન સચિવાલય કલાર્ક - 2016

71. યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન 'સીનેગોગ' ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ?
A) આણંદ B) અમદાવાદ C) પેટલાદ D) નવસારી

72. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ?
A) 1951 B) 1949 C) 1953 D) 1955

73. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.
A) બોચાસણ B) ગઢડા C) સાળંગપુર D) ગોંડલ

74. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો.
A) આનંદનગર B) વડાદરા C) વડુથલ D) આનંદપુર

75. નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો.
A) પ્રફુલ્લભાઈ ખરસાણી B) જયશંકર ભોજક
C) પ્રભાશંકર ત્રિવેદી D) અરવિંદ વૈધ

76. અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
A) સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
B) સ્વામીશ્રી ગંગેશ્વરનંદજી મહારાજ
C) સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
D) સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ

77. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.
A) ધર્મસાગરસુરીશ્વરજી B) વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.
C) યુગભૂષણસરીશ્વરજી D) બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.

78. કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે ?
A) જખનો મેળો B) ચિત્રવિચિત્રનો મેળો
C) રવેચીનો મેળો D) રાપરદેવનો મેળો

બિન સચિવાલય કલાર્ક - 21/12/2014

79. 'ભારતના માંચેસ્ટર' તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું?
A) સુરત B) રાજકોટ C) વલસાડ D) અમદાવાદ

80. મહિલાઓને પ્રિય એવી 'બાંધણી' માટે ક્યું શહેર જાણીતું છે?
A) જામનગર B) પાટણ C) મોરબી D) સુરત

81. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?
A) અંધશાળા B) બહેરા-મૂંગાની શાળા
C) પેરાપ્લેજીયા હોસ્પિટલ D) અનાથ આશ્રમ પ્રવૃત્તિ

GPSC પ્રિલિમ - 2001

82. "વેશ" સાથે કોનું નામ સંકળાયેલું છે ?
A) અસાઈત B) ડો.બળવંત જાની
C) જયશંકર સુંદરી D) ડો.નરેશ વેદ

83. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?
A) રવિશંકર મહારાજ B) રવિશંકર રાવળ
C) પંડિત રવિશંકર D) શ્રી શ્રી રવિશંકર

84. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે ક્યું સ્થળ જાણીતું છે ?
A) પ્રભાસપાટણ B) સિદ્ધપુર
C) ચાણોદ D) દ્વારકા

85. આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ?
A) જયશંકર સુંદરી B) મૃણાલિની સારાભાઈ
C) મલ્લિકા સારાભાઈ D) સ્મિતા શાસ્ત્રી

GPSC પ્રિલિમ - 2007

86. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે ?
A) લઘુચિત્ર B) પિછવાઈ
C) આધુનિક D) આમાની કોઈ નહીં

87. એલિસબ્રીજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ?
A) અંગ્રેજ અધિકારીનાં પત્ની B) એલિસ ઈન વન્ડરલેન્ડ
C) અંગ્રેજ અધિકારી D) આમાંના કોઈ જ નહીં

88. દિવાળીબેન ભીલનું નામ ક્યા સંગીત સાથે જોડવામાં આવે છે ?
A) લોક સંગીત B) શાસ્ત્રીય સંગીત
C) ફિલ્મી ગીતો D) સુગમ સંગીત

89. 'જય જય ગરવી ગુજરાત'ના રચયિતા કવિ કોણ ?
A) દયારામ B) નર્મદ
C) નરસિંહ મહેતા D) દલપતરામ

90. સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ?
A) ખ્રિસ્તી B) યહૂદી C) બૌદ્ધ D) શીખ

91. આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમૂક ઈમારતોનું નિર્માણ કર્યું હતું ?
A) ચાર્લ્સ કોરિયા B) જેક્બસન
C) લા કોરબુઝિયેર D) આમાંના કોઈ નહીં

68)A, 69)A, 70)A, 71)B, 72)A, 73)C, 74)D, 75)B, 76)B, 77)D, 78)C, 79)D, 80)A, 81)A, 82)A, 83)B, 84)B, 85)A, 86)B, 87)A, 88)A, 89)B, 90)B, 91)C.

92. મકરસંક્રાંતિનો અર્થ શું છે ?
A) ગુરુનો મકર રાશિમાં પ્રવેશ B) સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન
C) સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ D) ગુરુનું મકર રાશિમાં પ્રસ્થાન

93. બચુભાઈ રાવત ક્યા સામયિક સાથે સંકળાયેલા હતા ?
A) કુમાર B) પરબ C) અખંડ આનંદ D) કવિતા

94. તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
A) સુરેન્દ્રનગર B) રાજકોટ C) અમરેલી D) ભાવનગર

95. માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું ?
A) અંબાજી B) ચોટીલા C) કચ્છ D) પાવાગઢ

96. જહાંગીર સબાવાલા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
A) ફોટોગ્રાફી B) ચિત્રકળા C) અભિયાન D) લેખન

GPSC પ્રિલિમ - 2014

97. ગુજરાતમાં વિક્રમ સંવત અનુસાર નીચે આપેલા તહેવારોને મહિનાઓ મુજબ ગોઠવતાં સાચો ક્રમ ક્યો છે ?
1. દશેરા 2. હોળી
3. ગણેશચતુર્થી 4. ગુરુપૂર્ણિમા
5. રક્ષાબંધન
A) 3 - 4 - 5 - 1 - 2 B) 4 - 5 - 3 - 1 - 2
C) 2 - 4 - 5 - 3 - 1 D) 5 - 3 - 1 - 2 - 4

98. ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય'નો પ્રારંભ ક્યાં થયો હતો?
A) વ્યારા B) વાલોડ
C) સાબરમતી આશ્રમ, અમદાવાદ D) વઘઈ

99. ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
A) સંગ્રહાલય : જૂનાગઢ, 1849
B) મહિલા સહકારી બેંક : સુરત, 1994
C) અનાથાશ્રમ : અમદાવાદ, 1892
D) ઔદ્યોગિક વસાહત : વાપી, 1968

100. ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્‌ગોમંડલ' ક્યા વિદ્વાનોએ તૈયાર કરેલ?
A) શ્રી ધીરુભાઈ ઠાકર B) શ્રી ચંદુલાલ બહેચરભાઈ પટેલ
C) કવિ નર્મદ D) ગોવર્ધનરામ ત્રિપાઠી

PSI ખાતાકીય - 23/04/2017

101. ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) કચ્છ B) મહીસાગર C) પાટણ D) સુરેન્દ્રનગર

102. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) અમદાવાદ B) ભાવનગર C) સાબરકાંઠા D) આણંદ

103. જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલી છે ?
A) સુરેન્દ્રનગર જિલ્લો B) કચ્છ જિલ્લો
C) દેવભૂમિ દ્વારકા જિલ્લો D) પાટણ જિલ્લો

104. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યુ સુવિખ્યાત મંદિર આવેલ છે?
A) સૂર્ય મંદિર B) શનિદેવ મંદિર
C) બહુચર માતાનું સ્થાનક D) બાલકૃષ્ણ લાલજીની હવેલી

105. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યા નામે જાણીતું છે ?
A) મોહન મંદિર B) કિર્તી મંદિર
C) મહાત્મા મંદિર D) ગાંધી નિવાસ

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

106. સરોવર /તળાવ અને શહેર વચ્ચેનું ક્યું જોડકુ ખોટું છે?
A) સૂરસાગર - વડોદરા B) રણમલ - જામનગર
C) હમીરસર - અંજાર D) શર્મિષ્ઠા - વડનગર

PSI/ASI GK - 2/5/2015

107. પારસીઓના કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે ?
A) ઉદવાડા B) નારગોલ C) સંજાણ D) નવસારી

GPSC Class-1 - 2016

108. "ભવાઈ"ના પૂર્વજ નીચેના પૈકી કોણ છે ?
A) નરસિંહ B) અસાઈત C) બૈજનાથ D) માનસિંહ

109. ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે ?
A) ભક્તિધારાના B) જ્ઞાનધારાના
C) પ્રશિષ્ટધારાના D) રોમેંટિક ધારાના

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

110. ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
2) કાઠી ભરત B) સૌરાષ્ટ્ર વિસ્તાર
3) કણબી ભરત C) ખાવડા, બન્ની વિસ્તાર
4) મોતી ભરત D) અમરેલી જીલ્લો
A) 1-D, 2-C, 3-B, 4-A B) 1-A, 2-D, 3-C, 4-B
C) 1-B, 2-A, 3-D, 4-C D) 1-C, 2-B, 3-A, 4-D

GPSC Class - 2 - 29/1/2017

111. અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમુનો ગણાય છે?
A) હિન્દુ સ્થાપત્ય કલા શૈલી
B) ગુજરાતી શૈલી
C) મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી
D) હિન્દુ-ઈસ્લામી સ્થાપત્ય કલા શૈલી

92)C, 93)A, 94)A, 95)C, 96)B, 97)C, 98)A, 99)C, 100)B, 101)B, 102)A, 103)B, 104)A, 105)B, 106)C, 107)A, 108)B, 109)B, 110)D, 111)B.

GPSC Class - 2 - 18/12/2016

112. છાયલ, છેલારિયું, બિરોદક અને શાલપોત - એ શાનાં નામો છે?
A) વસ્ત્ર-પોશાક B) ભીતચિત્રો C) લિંપણ D) રંગોળી

113. ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે?
A) વડોદરા B) સૂરત C) ભાવનગર D) નડિયાદ

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

114. સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે?
A) મંડપ B) પુનિત C) શિકારા D) વિમના

115. અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે?
A) રૂડીબાઈની વાવ B) શ્રીમાળીની વાવ
C) ભીમાની વાવ D) ઝરણાવાળી વાવ

GPSC Class - 2 - 12/2/2017

116. "ભવાઈ" ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે?
A) કરતાલ B) ઢોલક C) ભૂંગળ D) એકતારો

117. નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝીયમ) સૌથી જૂનું છે?
A) બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
B) બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા
C) કચ્છ મ્યુઝિયમ, ભૂજ
D) વેસ્ટર્ન મ્યુઝિયમ, રાજકોટ

118. "પિઠોરા" શું છે?
A) આદિવાસી તહેવાર B) આદિવાસી ચિત્રકળા
C) આદિવાસી નૃત્ય D) આદિવાસી સંગીત

119. જોવાલાયક સ્થળ અને તેના સ્થાન ને યોગ્ય રીતે ગોઠવો.
1) હૃદય કુંજ A) રાજકોટ
2) કીર્તિ મંદિર B) પોરબંદર
3) કબા ગાંધીનો ડેલો C) અમદાવાદ
4) સહસ્ત્રલીંગ તળાવ D) પાટણ
A) 1 -B, 2 -A, 3 -D, 4 -C B) 1 -C, 2 -B, 3 -A, 4 -D
C) 1 -A, 2 -D, 3 -C, 4 -B D) 1 -D, 2 -C, 3 -B, 4 -A

120. 'અકીક'ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે?
A) ખંભાત B) અમદાવાદ C) બાલાસિનોર D) પાટણ

GPSC Class - 2 - 28/1/2017

121. ગુજરાતનાં સ્થાપત્ય/સ્થાનોને યોગ્ય રીતે ગોઠવો.
1) ઝૂલતા મિનારા A) પાટણ
2) હીરા ભાગળ B) ચાંપાનેર
3) જુમા મસ્જિદ C) ડભોઈ
4) રાણકીવાવ D) અમદાવાદ
A) 1-D, 2-C, 3-B, 4-A B) 1-C, 2-B, 3-A, 4-D
C) 1-B, 2-A, 3-D, 4-C D) 1-A, 2-D, 3-C, 4-B

122. રાજયમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે?
A) વડનગર B) દેવમાલ
C) કપડવંજ D) ઉપરોકત બધાજ

123. ગામ / સ્થળનું નામ — જોવાલાયક સ્થળ
1) અંજાર A) ભુવનેશ્વરી શકિતપીઠ
2) માંડવી B) જેસલ તોરલ સમાધી
3) મોરબી C) વિજય વિલાસ પેલેસ
4) ગોંડલ D) મણિમંદિર
A) 1-D, 2-A, 3-B, 4-C B) 1-C, 2-D, 3-A, 4-B
C) 1-A, 2-B, 3-C, 4-D D) 1-B, 2-C, 3-D, 4-A

124. રાજયના ગ્રંથભંડારો અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) ભો.જે.વિદ્યાભવન A) અમદાવાદ
2) પ્રાચ્ય વિદ્યામંદિર B) વડોદરા
3) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર C) કોબા
4) ફાર્બસ ગુજરાતી સભા D) મુંબઈ
A) 1-B, 2-C, 3-D, 4-A B) 1-A, 2-B, 3-C, 4-D
C) 1-C, 2-D, 3-A, 4-B D) 1 D, 2-A, 3-B, 4-C

125. નૃત્ય પ્રકાર અને તેના સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) ટિપ્પણી નૃત્ય A) ચોરવાડ પંથક
2) રાસ અને રાસડા B) પંથક સૌરાષ્ટ્ર
3) ડાંગા નૃત્ય C) ઉત્તર ગુજરાત
4) ભાયાનૃત્ય D) ડાંગ જીલ્લો
A) 1-A, 2-B, 3-C, 4-D B) 1-B, 2-C, 3-D, 4-A
C) 1-C, 2-D, 3-A, 4-B D) 1-D, 2-A, 3-B, 4-C

126. મહેલો અને તેનાં સ્થાનોને યોગ્ય રીતે ગોઠવો.
1) આયનાં મહેલ A) રાજપીપળા
2) લક્ષ્મી વિલાસ પેલેસ B) વડોદરા
3) વિજય પેલેસ C) વાંકાનેર
4) અમર પેલેસ D) ભુજ
A) 1-D, 2-B, 3-A, 4-C B) 1-B, 2-A, 3-C, 4-D
C) 1-A, 2-C, 3-D, 4-B D) 1-C, 2-D, 3-B, 4-A

GPSC Class-1 - 15/01/2017

127. ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ?
A) ભવનાથનો મેળો B) તરણેતરનો મેળો
C) શામળાજીનો મેળો D) વૌઠાનો મેળો

128. સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ?
A) અમદાવાદ B) અમરેલી C) જૂનાગઢ D) સુરેન્દ્રનગર

129. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલા જોવી મળે છે ?
A) તાંડવ નૃત્ય B) ગરબા C) ભવાઈ D) નાટક

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

130. ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ?
A) આદિવાસી B) ભરવાડ C) ઠાકોર D) રબારી

112)A, 113)D, 114)B, 115)A, 116)C, 117)C, 118)B, 119)B, 120)A, 121)A, 122)D, 123)D, 124)B, 125)A, 126)A, 127)D, 128)D, 129)C, 130)A.

131. નીચેનામાંથી ક્યુ નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ?

A) અખો B) મીરાબાઈ

C) નરસિંહ મહેતા D) અસાઈત

132. ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

A) આસો નવરાત્રી B) ચૈત્ર નવરાત્રી

C) માઘ નવરાત્રી D) અસાઢ નવરાત્રી

133. "હૂડો" શું છે ?

A) રાગનો પ્રકાર B) સંગીતવાદ્ય

C) નૃત્યનો પ્રકાર D) ચિત્રકાળ

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

134. નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

A) ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે.

B) ગરબી એ પુરુષોનું નૃત્ય છે.

C) ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે.

D) ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી.

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

135. "તરણેતર"નો મેળો ક્યા મહિના દરમ્યાન યોજાય છે?

A) ભાદ્રપદ B) અષાઢ C) શ્રાવણ D) માઘ

136. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે?

A) સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ

B) કેલીકો મ્યુઝિયમ, અમદાવાદ

C) વોટસન મ્યુઝિયમ, રાજકોટ

D) સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત

137. વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત-કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં?

A) પંડીત ભાસ્કરબુવા B) ઉસ્તાદ મૌલા બક્ષ

C) ઈનાયત ખાન D) ઉસ્તાદ ફૈયાઝ ખાન

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

138. નીચેના પૈકી ક્યું ગુજરાતનું લોકનૃત્ય છે?

A) ઘેરીયા B) ઝુમર C) પઢાર D) ઉપરના તમામ

139. વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે?

A) ઢાંક B) ઉપરકોટ C) ખંભાલીડા D) આબુ

GPSC Class - 2 - 18/03/2017

140. ધર્મ - સંપ્રદાય અને મંદિર પુજા સ્થાને યોગ્ય રીતે ગોઠવો.

1) વૈષ્ણવ સંપ્રદાય A) અમદાવાદ

2) જરથોસ્તી ધર્મ B) ઉદવાડા

3) ખ્રિસ્તી ધર્મ C) દ્વારકા

4) બહાઈ ધર્મ D) ખંભાત

A) 1-B, 2-D, 3-A, 4-C B) 1-C, 2-B, 3-D, 4-A

C) 1-D, 2-A, 3-C, 4-B D) 1-A, 2-C, 3-B, 4-D

141. પ્રાચીન સ્મારક/મકાન અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.

1) એન્ડ્રુઝ લાયબ્રેરી A) પાટણ

2) લક્ષ્મીવિલાસ પેલેસ B) સુરત

3) સંતરામ મંદિર C) વડોદરા

4) રાણકીવાવ/રાણીની વાવ D) નડિયાદ

A) A-4, B-1, C-2, D-3 B) A-3, B-4, C-1, D-2

C) A-4, B-1, C-2, D-3 D) A-1, B-2, C-3, D-4

GPSC Class - 1 - 28/01/2017

142. ચિત્રવિચિત્રનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?

A) સાબરકાંઠા B) બનાસકાંઠા C) પંચમહાલ D) ડાંગ

143. નીચેની પૈકી કઈ જોડી અયોગ્ય છે?

A) રાઠવા- પીઠોરાના ચિત્રો B) ભીલો - ભારાડીના ચિત્રો

C) કુંકણીઓ - ગોગજના ચિત્રો D) ચૌધરીઓ - નવાના ચિત્રો

144. મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં ક્યું વિધાન સાચું નથી?

A) આ મંદિરનું ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું

B) આ મંદિરનું નક્શીકામ ગાંધારશૈલીમાં થયેલું છે

C) મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે?

D) આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે

145. હાલી નૃત્ય કઈ આદિજાતિનુ લોકનૃત્ય છે?

A) ભીલ B) દૂબળા C) પઢાર D) ચારણ

146. ભવાઈના પિતા અસાઈત ઠાકર ક્યાંના વતની હતા?

A) મહેસાણા B) પાટણ C) સિધ્ધપુર D) પાલનપુર

147. ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજુ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

A) નરસિંહ મહેતા B) લીલુડી ધરતી

C) મુંબઈની શેઠાણી D) કંકુ

148. નીચેનામાંથી ક્યું જોડકુ બંધ બેસતું નથી?

A) લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ B) વિજયવિલાસ પેસેલ - ભુજ

C) અડાલજની વાવ - ગાંધીનગર D) પ્રાગમહલ - ભુજ

131)D, 132)A, 133)C, 134)A, 135)A, 136)A, 137)B, 138)D, 139)C, 140)B, 141)C, 142)A, 143)C, 144)B, 145)B, 146)C, 147)A, 148)A.

149. 'ભૂજોડી' શું છે?

A) કચ્છમાં વસ્તી એક જાતિ

B) અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ

C) ભૂજની બાંધણીનું સ્થાનિક નામ

D) ભૂજની એમ્બ્રોડરીની એક જાતનું નામ

નાયબ ચિટનીશ - 02/06/2015

150. કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ?

A) બૌદ્ધ B) પારસી C) હિન્દુ D) જૈન

151. મોઢેરાના સૂર્યમંદિરની રચના.........છે.

A) પૂર્વાભિમુખ B) ઉત્તરાભિમુખ

C) દક્ષિણાભિમુખ D) પશ્ચિમાભિમુખ

GPSC Class - 2 - 16/04/2017

152. ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ'ની સ્થાપના કોણે કરેલ છે ?

A) સોનલ માનસિંગ B) કુમુદિની લાખિયા

C) મલ્લિકા સારાભાઈ D) મૃણાલીની સારાભાઈ

153. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ક્યા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ?

A) સોમલાલ શાહ B) રાજા રવિ વર્મા

C) એમ.એફ. હુસેન D) રસિકલાલ અંધારિયા

154. અડાલજની વાવ કોણે બંધાવેલ છે ?

A) રાણી રૂડીબાઈ B) મીનળ દેવી

C) ચૌલા દેવી D) ધ્રુવસ્વામીની દેવી

155. સ્થાપત્ય અને તેના સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.

1) ઉપરકોટ કિલ્લો A) માંડવી

2) પ્રાગ મહેલ B) જામનગર

3) લખોટા મહેલ C) ભૂજ

4) વિજયવિલાસ પેલેસ D) જૂનાગઢ

A) 1-D, 2-C, 3-B, 4-A B) 1-C, 2-B, 3-A, 4-D

C) 1-B, 2-A, 3-D, 4-C D) 1-A, 2-D, 3-C, 4-B

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

156. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદભવી ?

A) ગુર્જર અપભ્રંશ B) ડીંગલ C) મારૂ પ્રાકૃત D) પાલી

GPSC Class - 2 - 12/02/2017

157. વડોદરામાં ઈ.સ.1890 માં "કલાભવન" ની સ્થાપના નિમ્નદર્શિત ક્યા હેતુ માટે કરવામાં આવેલ હતી?

A) ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે

B) તાંત્રિક શિક્ષણ આપવા માટે

C) પર્ફોમીંગ આર્ટસના વિકાસ માટે

D) ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

GPSC Class - 1 - 09/04/2017

158. વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

A) ઉસ્તાદ મૌલાબક્ષ B) ઉસ્તાદ ફૈયઝખાન

C) પંડિત વિષ્ણુ નારાયણ D) ઉસ્તાદ ઈન્યાત હુસેનખાન

159. ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક - "સ્ત્રી બોધ" પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા ક્યા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ?

A) 1832 B) 1857 C) 1861 D) 1865

160. નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?

A) મેરાયો B) ચાળો C) કાનુડો D) સાંઢણી

161. નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી "વેસર" શૈલી ગુજરાતમાં ક્યા નામે ઓળખાય છે ?

A) હોયશાલા શૈલી B) ચોલ શૈલી

C) વાઘેલા શૈલી D) ચાલુક્ય શૈલી

162. નૃત્યક્ષેત્રમાં સુનીલ કોઠારીની આગવી ઓળખ શું ?

A) નૃત્ય દિગ્દર્શક

B) ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર

C) નૃત્ય ઈતિહાસજ્ઞ D) નૃત્યનાટકોના લેખક

GPSC Class - 2 - 04/03/2017

163. ક્યા નૃત્ય વખતે 'હુડિલા' કે 'હુંડલા' પ્રકારના શૌર્યગીતો ગવાય છે?

A) મેરનૃત્ય B) મોરાયો C) ડાંગીનૃત્ય D) ગોફગૂંથણ

164. કૃષ્ણકાંત કડકિયા ક્યા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે ?

A) સંગીતવાદન B) કવિતા

C) ભવાઈ D) નવલકથા સાહિત્ય

165. ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ ?

A) હોથલ પદમણી B) જેસલ તોરલ

C) જિગર અને અમી D) લાખો ફૂલાણી

149)D, 150)D, 151)A, 152)D, 153)B, 154)A, 155)A, 156)A, 157)B, 158)D, 159)B, 160)B, 161)D, 162)C, 163)B, 164)C, 165)B.

GPSC Class - 2 - 18/03/2017

166. "મશીરા" વાદ્ય ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે ?
A) પઢાર B) ડાંગી C) ધમાલ D) ટીપ્પણી

167. ક્યા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચુ બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ?
A) પ્રભાશંકર સોમપુરા B) બાલકૃષ્ણ દોશી
C) મધે ગુરૂજી D) કાન્તીભાઈ પટેલ

168. નીચે પૈકી ગુજરાતનું ક્યું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?
A) કડીયા ડુંગરની ગુફાઓ B) જોગીડાની ગુફા
C) દેવની મોરી D) ભુજિયો કોઠો

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

169. ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદ્‌ભવ............માં થયો હતો.
A) ચૌદમી સદી B) તેરમી સદી C) પંદરમી સદી D) બારમી સદી

170. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ?
A) રસિકલાલ અંધારિયા B) હસુ યાજ્ઞિક
C) મધુસુદન ઢાંકી D) અમુભાઈ દોશી

171. નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી ?
A) રવિશંકર રાવળ - ચિત્રકાર B) અંજલિ મેઢ - ચિત્રકાર
C) પિરાજી સાગરા - ચિત્રકાર D) સોમાલાલ શાહ - ચિત્રકાર

172. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ?
A) મનોરમા B) સતી સાવિત્રી
C) રાણકદેવી D) જેસલ તોરલ

173. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યા નામે ઓળખાય છે?
A) ચાળો B) કોળી નૃત્ય C) રૂમાલ નૃત્ય D) ભીલ નૃત્ય

174. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો ક્યા નામથી ઓળખાય છે ?
A) પટોળા B) પીંછોરા
C) પીછવાઈ D) વારલી ભીંત ચિત્ર

175. ક્યા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે?
A) દમયંતી બરડાઈ B) હમિદા મીર
C) મિનલ રાઠોડ D) દિવાળીબેન ભીલ

GPSC Class - 2 - 11/12/2016

176. 'ઢોલો રાણો' નામનું નૃત્ય ક્યા વિસ્તારમાં પ્રચલિત હતું ?
A) બાબરિયાવાડ B) ગોહિલવાડ
C) સોરઠ D) હાલાર

177. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ?
A) ભીલ, કણબી, વરલી B) ભીલ, કણબી અને રાઠવા
C) ભીલ, કણબી અને વસાવા D) વરલી, વસાવા અને હળપતિ

GPSC Class - 2 - 05/02/2017

178. ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી?
A) અમદાવાદ B) મુંબઈ C) વડોદરા D) જૂનાગઢ

179. નીચેના પૈકી ક્યું વસ્ત્ર પુરૂષો જ ધારણ કરે છે?
A) જીમી B) મોસલો C) મોસરિયું D) ટંગલિયો

180. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે?
A) દર્શના ઝવેરી B) અંજલિ મેઢ
C) સ્મિતા શાસ્ત્રી D) શ્વેતા શાહ

181. ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો?
A) 1974 B) 1970 C) 1964 D) 1956

182. ક્યા પ્રકારના ગીતોને "રાજિયા" કહેવામાં આવે છે?
A) પ્રણય ગીતો B) વિનોદ ગીતો
C) વિરહ ગીતો D) કલ્પાંત ગીતો

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

183. 'ભૂંગળિયો' અને 'પેટી માસ્તર' શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે?
A) ગુજરાતનું લોકનાટ્ય B) ગુજરાતના લોકગીત
C) લોકનૃત્ય મેરાયો D) લોકનૃત્ય મેર

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

184. 'પરિત્રાણ','અંતિમ અધ્યાય','ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?
A) મનોહર ત્રિપાઠી B) મનુભાઈ પંચોળી
C) પન્નાલાલ પટેલ D) નાથાલાલ દવે

185. ગંગાસતીના માતાનું નામ શું હતું ?
A) કાશીબા B) રૂપાળીબા C) જીવીબા D) ગુલાબબા

186. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ?
A) શ્યામલાલ ભગત B) ચીનુભાઈ ભગત
C) ચુનીલાલ ભગત D) શનાલાલ ભગત

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

187. ક્યા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ?
A) એમ. એફ. હુસેન B) નંદલાલ બોઝ
C) રવિ વર્મા D) રવિશંકર રાવળ

166)C, 167)D, 168)D, 169)A, 170)C, 171)B, 172)D, 173)A, 174)B, 175)D, 176)B, 177)A, 178)C, 179)C, 180)B, 181)B, 182)D, 183)A, 184)B, 185)B, 186)C, 187)D.

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

188. 'રાણકી વાવ' ક્યાં આવેલી છે ?
A) પાટણ B) મોઢેરા C) જૂનાગઢ D) અડાલજ

189. 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ....
A) અવિનાશ વ્યાસ B) જશવંત ઠાકર
C) મૃણાલિની સારાભાઈ D) જયશંકર 'સુંદરી'

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

190. ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.
A) ડૉ. ઉમાશંકરજોષી B) હરસિદ્ધભાઈ દિવેટીયા
C) પ્રો. મગનભાઈ દેસાઈ D) નરસિંહરાવ દિવેટીયા

191. પ્રતિવર્ષ કાર્તિકી પુનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે ક્યો મેળો ભરાય છે ?
A) તરણેતરનો મેળો B) ભવનાથ મહાદેવનો મેળો
C) સંસ્કૃતિકુંજ મેળો D) વૌઠાનો મેળો

GSSSB સર્વેયર - 2016-17

192. અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
A) સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
B) સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
C) સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
D) સ્વામીશ્રી રવિશંકર મહારાજ

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

193. "કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા?
A) રવિ શર્મા B) કનુભાઈ દેસાઈ
C) રવિશંકર રાવળ D) સોમાલાલ શાહ

194. ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે?
A) તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે
B) તેની આગવી ચિત્રકળા શૈલી માટે
C) માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઈન્ટીંગ માટે
D) ઉપર્યુક્ત એક પણ નહી.

195. "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
A) નાટ્ય કળા B) નૃત્ય કળા
C) હાથશાળ દ્વારા વણાટની એક કળા
D) ગૂંથણની કળા

વિસ્તરણ અધિકારી - 7/1/2017

196. ગુજરાતના જાણીતા તરણેતરના મેળમાં નીચેના પૈકી કોનું સ્થાનક છે?
A) બ્રહ્મા B) વિષ્ણુ C) શિવ D) રામ

197. ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ?
A) પાલીતાણા B) કાયાવરોહણ C) શંખેશ્વર D) મહુડી

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

198. ભવાઈના રચયિતાનું નામ જણાવો.
A) ભાલણ B) અસાઈત ઠાકર
C) મંડણ બંધારો D) વલ્લભ ઠાકર

199. મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે?
A) ન્હાનાલાલ B) દલપતરામ
C) રણછોડભાઈ D) દયારામ

200. 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?
A) ગુજરાત વિદ્યાસભા B) ગુજરાતી સાહિત્ય પરિષદ
C) વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર D) ગુજરાત વિદ્યાપીઠ

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

201. ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.

1) અડાલજની વાવ	A) મીનળદેવી
2) રાણકી વાવ	B) અનુપમાદેવી
3) ધોળકાનું મલાવ તળાવ	C) રાણી ઉદયમતી
4) દેલવાડાના દેરા	D) રૂડાબાઈ

A) 4-b, 2-c, 3-d, 1-a B) 2-c, 4-b, 1-d, 3-a
C) 3-a, 2-c, 4-d, 1-b D) i-b, 3-a, 2-b, 4-c

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

202. ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે?
A) ગાંધીનગર B) મહેસાણા C) અમદાવાદ D) રાજકોટ

203. ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ ક્યા જિલ્લામાં આવેલું છે?
A) રાજકોટ B) ભાવનગર C) ગીર સોમનાથ D) જૂનાગઢ

204. ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે?
A) પોરબંદર B) ભરૂચ C) અરાવલી D) ભાવનગર

205. ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા ક્યા જિલ્લામાં આવેલું છે?
A) ભાવનગર B) જૂનાગઢ
C) સુરેન્દ્રનગર D) ગીર સોમનાથ

206. ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ આધારામ ક્યા જિલ્લામાં આવેલું છે ?
A) સાબરકાંઠા B) બનાસકાંઠા C) પંચમહાલ D) ડાંગ

188)A, 189)D, 190)B, 191)D, 192)B, 193)C, 194)B, 195)C, 196)C, 197)D, 198)B, 199)B, 200)C, 201)B, 202)C, 203)A, 204)D, 205)C, 206)B.

207. જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર ક્યા જિલ્લામાં આવેલું છે ?

A) જૂનાગઢ B) બોટાદ C) કચ્છ D) ભાવનગર

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

208. મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? - દેલમાલ

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

209. અનસુયાબેન સારાભાઈનું ક્યા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ?
- **શ્રમ અને સંગઠન**

210. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે ક્યા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ? - **ચોરવાડ**

211. ગોફગુંથનરાસ ક્યા સમાજનું લોકનૃત્ય છે ? - **સૌરાષ્ટ્રના કોળી-કણબી**

212. અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ? - **શાસ્ત્રીય સંગીત**

213. લેડી વિલ્સન મ્યુઝિયમ - **માનવજાત શાસ્ત્રને લગતા નમૂના - ધરમપુર, ભો. જે. વિદ્યાભવન - અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ સંદર્ભ મ્યુઝિયમ - અમદાવાદ, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ - પર્સોનેલિયા મ્યુઝિયમ - ભાવનગર**

પોલીસ કોન્સ્ટેબલ - 2012

214. ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે? - **સંગીત**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

215. 'અસ્મિતા પર્વ' ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?
- **હનુમાન જયંતિ**

216. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ક્યો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?
- **પલ્લીનો મેળો**

217. ક્યું જોડકું સાચું છે ?
- **અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ, સતાધાર - આપા ગીગાની સમાધિ, અંજાર - જેસલ તોરલની સમાધિ**

218. મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ?
- **સૂર્ય મંદિર**

219. સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતા ગીત વિશેષને શું કહેવામાં આવે છે? - **રાસ**

220. 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?
- **સમાજદર્પણ**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

221. ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો ક્યા સ્થળે ભરાય છે ?
- **ગુણભાખરી**

222. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા ક્યું નૃત્ય કરવામાં આવે છે ? - **ટિપ્પણી નૃત્ય**

223. ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ?
- **લક્ષ્મી વિલાસ (વડોદરા)**

224. શારદાપીઠ નીચેનામાંથી ક્યા સ્થળે આવેલ છે ? - **દ્વારકા**

મહેસૂલી તલાટી - 2014

225. ભવાઈનો ક્યો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે ?
- **રામદેવનો વેશ**

226. "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ? - **ધોરડો**

227. ગુજરાતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મ કઈ ? - **નરસિંહ મહેતા**

TET- II - ભાષા - 2014

228. નારગોલમાં કોનો આશ્રમ આવેલ છે ? - **મહર્ષિ અરવિંદ**

229. ક્યા મંદિરના બે દ્વારો ગર્ભદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે ? - **દ્વારકા**

230. ઝવેરી બહેનો કઈ નૃત્યકલા માટે જાણીતા છે? - **મણીપુરી**

231. વડનગરનું પ્રાચીન નામ શું છે ?
- **ચમત્કારપુર, આનર્તપુર, આનંદપુર**

TET- II - ભાષા - 2015

232. મેરાયો ક્યા લોકોનું લોકનૃત્ય છે ?
- **બનાસકાંઠાના વાવ સુઈગામ તાલુકાના ઠાકોરનું**

233. વોટસન સંગ્રહાલય ક્યા આવેલું છે ? - **રાજકોટ**

234. કલમ, કછડી અને પછડી શબ્દો કઈ જાતિ સાથે સંકળાયેલા છે?
- **ચારણ**

207)A.

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

235. તારંગા ક્યા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે ? - **જૈન**

236. ક્યા મંદિરોને 'સંગેમરમરમાં કંડારેલ કાવ્ય'ની ઉપમાં આપવામાં આવી છે? - **દેલવાડાના જૈન મંદિરોને**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

237. સ્થાપત્ય કલાનો મુલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યા આવેલી છે? - **અમદાવાદ**

238. ક્યા મંદિરને 6 (છ) માળવાળું શિખર છે ? - **દ્વારકાધીશનું મંદિર**

239. તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલ હસ્તપત્રો - **શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા, હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી - પાટણ, ગૂજરાત વિદ્યાપીઠ - અમદાવાદ**

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

240. વારલી એ કઈ કળાં છે ? - **ચિત્ર**

241. ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ? - **સીદી**

242. ગુજરાતનાં ધાર્મિક સ્થળો બાબતે નીચે પૈકી કયું વિધાન સૌથી વધુ યોગ્ય ગણાય ? - **અંબાજી, જિલ્લો : બનાસકાંઠા - ત્ર્યાંબાવટી નગરી, ભડિયાદ, જિલ્લો : અમદાવાદ - ઉર્સનો મેળો, દ્વારકા, જિલ્લો : દેવભૂમિ દ્વારકા - શારદાપીઠ**

243. ગુજરાતનાં કુમુદીની લાખિયા કયાં ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? - **નૃત્યકલા**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

244. ખોડીદાસ પરમાર એ કઈ કલાના સાધક છે? - **ચિત્ર**

245. નર્મદા સ્તુતિ નમામિ દેવી નર્મદે.... સાથે નીચેની કઈ કડી જોડાયેલી છે? - **ત્વદીય પાદ પંકજમ્**

246. ગુજરાતના પર્વતો સંબંધમાં નીચેના પૈકી કઈ માહિતી સાચી છે? - **પાવાગઢ-મહાકાલી મંદિર-હાલોલ તાલુકો, અબ્બર-અંબાજી માતા મંદિર-દાંતા તાલુકો, ચોટીલાડુંગર-ચામુંડા માતા મંદિર-ચોટીલા તાલુકો**

247. ભારતીય સંસ્કૃતિક મંદિર (ઇન્ડોલોજી) સંબંધમાં કઈ બાબત સાચી છે? - **75000થી વધુ હસ્તપ્રતો ધરાવતી આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે**

248. સોમનાથ જ્યોતિર્લિંગ સંબંધમાં કઈ માહિતી સાચી છે? - **1947 આઝાદી પછી સરદાર પટેલ સોમનાથની મુલાકાત લઈ સરકાર દ્વારા નવું મંદિર બાંધવાનો સંકલ્પ કરેલો, 1951માં રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરેલી, 1947 આઝાદી પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી પ્રભાશંકર સોમપુરાને સોંપાયેલી**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

249. દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ? - **કનુ દેસાઈ**

250. ભવાઈ મંડળીના મોવડીને............નામે ઓળખવામાં આવે છે. - **નાયક**

251. નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ ? - **લીલુડી ધરતી**

252. હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમુ તીર્થસ્થાન..........માં આવેલું છે ? - **પીરાણા**

253. નીચે સરોવર/તળાવ અને શહેરના નામ આપ્યા છે તેની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે? - **શર્મિષ્ઠા તળાવ : વડનગર, ખાન સરોવર : પાટણ, ચંદન તળાવ : વડોદરા, ગોપી તળાવ : સુરત**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

254. ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ? - **બૈજુ બાવરા**

સબરજિસ્ટ્રાર - 2013

255. સાચું યુગ્મ - **રંગોત્સવ - ધોરડો, તાનારીરી મહોત્સવ - વડનગર, ગ્રીષ્મ મહોત્સવ - સાપુતારા**

256. રૂડાની વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવી છે ? - **ગાંધીનગર**

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

257. 'ધમાલ' કઈ જાતિનું લોકનૃત્ય છે? - **સીદી**

258. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો છે? - **નવરાત્રિ**

259. કયા તહેવારમાં ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને બહેનને ભેટ આપે છે? - **ભાઈ બીજ**

PSI - 2012

260. ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો ક્યા મહિનામાં થાય છે? - **ભાદરવો**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

261. ગુરુ પૂર્ણિમા ઉત્સવ ક્યા મહિનામાં આવે ? : **અષાઢ**

262. ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો ક્યા સ્થળે ભરાય ? : **ગિરનારની તળેટીમાં**

263. ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો ? : **ઝંડુ ભટ્ટજી**

264. ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે ? : **વૈજ્ઞાનિક**

265. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ? : **સહજાનંદ સ્વામી**

266. ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? : **મોતીભાઈ અમીન**

267. 'બુધિયો દરવાજો' ગુજરાતના ક્યા સ્થાપત્યનો એક ભાગ છે ? : **ચાંપાનેરનો કોટ**

268. કુચીપૂડી નૃત્યમાં પારંગત સ્મિતા શાસ્ત્રી ગુજરાતની કઈ સંસ્થાની વિદ્યાર્થીની ? : **દર્પણ સંસ્થા - મૃણાલિની સારાભાઈ**

269. ક્યું સ્થાપત્ય 'અમદવાદના રત્ન' તરીકે પ્રખ્યાત છે ? : **રાણી સિપ્રીની મસ્જિદ ..**

270. કચ્છ-સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે ? - **ઘંટીઘોડા**

271. 'લોકસાહિત્ય વિદ્યાલય' ગુજરાતમાં ક્યાં આવેલું છે ? : **જામનગર**

272. સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ ક્યું હતું ? : **શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ**

273. સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા ? : **ચાંપાનેર**

274. હવેલી સંગીત ગુજરાતમાં ગવાતા ક્યા પ્રકારના ગીતો છે ? - **ધાર્મિક**

275. પારસીઓના કાશી તરીકે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે ? : **ઉદવાડા**

276. ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું પૂરું નામ જણાવો. : **ધન્ના કેશદ કાકડિયા** .

277. સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? : **ભગવાન પરશુરામે**

278. તેરા દરબારગઢ ભીંતચિત્ર ક્યા જિલ્લામાં જોવા મળે છે ?- **કચ્છ**

279. 'આગગાડી' કૃતિ કોણે લખેલી છે ? - **ચંદ્રવદન મહેતા**

280. જ્ઞાનવાળી વાવ ક્યા આવેલી છે ? - **સિદ્ધપુર**

281. ચોરવાડ પંથકની કોળણ બહેનો/નૃત્યકારોનું નૃત્ય જણાવો. - **ટિપ્પણી નૃત્ય**

282. શબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યા જોવા મળે ? - **શામળાજી**

283. ભૂંગળ વાદ્ય સાથે ભજવાતું સંગીતપ્રધાન નાટકને શું કહેવાય ? - **ભવાઈ**

284. ખૂંપાવાળી પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? - **બરડા**

285. મધુસૂદન ઢાંકી એટલે ? - **સ્થાપત્ય**

286. 'અબજોના બંધન'ના રચયિતા કોણ છે ? - **નૃસિંહ વિભાકર**

287. સૌરાષ્ટ્રની કણબી/કોળી બહેનો/નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવેલું છે ? - **સોળંગા રાસ**

288. આર્યસુબોધક નાટક મંડળી ક્યા આવેલ છે ? - **મોરબી**

289. ગુજરાતની 700 વર્ષ જુની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા એટલે? - **ભવાઈ**

290. પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાના જાણીતા વ્યક્તિનું નામ જણાવો - **અંબુભાઈ પટેલ**

291. સૌરાષ્ટ્રના નૃત્યકારોનું નૃત્ય ક્યા નામથી જાણીતું છે ? - **દાંડીયારાસ**

292. ઉત્તર ગુજરાતના ઠાકોરો/નૃત્યકારોના નૃત્ય ક્યા નામથી . ઓળખવામાં આવે છે ? - **ઠાગા નૃત્ય**

293. 'લલિતા દુઃખદર્શક'ના લેખક કોણ છે ? - **રણછોડભાઈ ઉદયરામ**

294. ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ? - **ગોંડલ**

295. દેશી નાટક સમાજ સંસ્થા ક્યા આવેલ છે ? - **અમદાવાદ**

296. કલકી સ્થાપત્ય ક્યા આવેલું છે ? - **પાટણની રાણીની વાવ**

297. ગુજરાતની કઈ કળા વિશ્વની અદશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે ?
- **સંખેડા લાખ વર્ક**

298. ભમ્મરિયો કૂવાની રચના ક્યા થયેલી છે ? - **મહેમદાવાદ**

299. હોમાઈ વ્યારાવાળાને પ્રથમ શું બનવાનું બહેમાન મળેલું છે ? - **મહિલા છબીકલા**

300. રવિ વર્મા...............ના દરબારમાં કામ કરતો હતો.- **ગાયકવાડ**

301. આંટિયાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ? - **ઓખા પ્રદેશ**

302. લક્ષ્મી-વિજય નાટક મંડળી ક્યા આવેલી છે ? - **સુરત**

303. યશોધર મહેતાનું યોગદાન ક્ષેત્ર જણાવો. - **સાહિત્ય**

304. ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? - **મોરબી મચ્છુકાંઠા**

305. ઉસ્તાદ ફૈયાઝ હુસૈનખા ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? - **સંગીત**

306. ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગુજરાતમાંથી ઉદ્ભવેલા ઘણા રાગોથી ગુજરાતે યોગદાન આપેલ છે, તે રાગ જણાવો. - **બિલાવલ, સોરઠી, ખંભાવતી**

307. પોરબંદર ખાતે ક્યા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? - **હરસિદ્ધિ માતા**

308. ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ક્યા આવેલું છે ? - **મોઢેરા**

309. કનુ દેસાઈ એટલે ? - **ચિત્રકલા**

310. ભગવાનલાલ ઈન્દ્રજીએ ક્યા ક્ષેત્રમાં યોગદાન આપેલું છે ?- **પુરાતત્ત્વવિદ્**

311. કેરળથી આવીને ગુજરાતમાં જ સ્થિર થયેલા નૃત્યગુરુઓ ભાસ્કર અને રાધા મેનન દ્વારા સ્થાપિત નૃત્ય સંસ્થાનું નામ શું છે? - **મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ**

312. બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા ક્યા જિલ્લામાં આવેલ છે ? - **રાજકોટ**

313. બ્રહ્મા-નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **સુરત**

314. ગુજરાતના ક્યા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી ? - **વડનગર**

315. સિદ્ધપુર ખાતે ક્યા માતાનું મંદિર આવેલું છે ? - **સરસ્વતી**

316. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે ? - **ચાલુક્ય શૈલી**

317. ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્થળ માધવપુર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **પોરબંદર**

318. ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ભાવનગર**

319. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? - **1951**

320. ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ? - **બૈજુ-બાવરા**

321. પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ?- **ભીમદેવની રાણી ઉદયમતીએ**

322. ગુજરાતમાં બે નાગર કન્યાઓ તાના અને રીરીએ મેઘ મલ્હાર રાગ ગાઈને સંગીતરત્ન તાનસેનના દાહનું શમન કર્યું હતું, આ બંને કન્યાઓની સમાધિઓ ક્યા આવેલી છે ? - **વડનગરની મધ્યમાં આવેલ શર્મિષ્ઠા તળાવના ઓવારે**

323. કઈ જયંતી દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? - **અડખે પડખે**

324. ગઝલના પહેલા શેરને.......અને છેલ્લા શેરને......કહેવાય છે. - **મત્લા, મક્તા**

325. યુનેસ્કો દ્વારા ગુજરાત રાજ્યમાં ક્યા ક્યા સ્થાનોનો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે ? - **રાણકી વાવ-પાટણ, અમદાવાદ શહેર, ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક**

326. કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યા આવેલો છે ? - **માંડવી**

327. ગુજરાતના મ્યુઝિયમોમાં સૌથી જૂનું ઈ.સ.1871માં સ્થપાયેલ કચ્છની ભાતીગળ કળાના તેમજ અલભ્ય નમૂનાઓ ઉપરાંત 1લીથી 6ઠ્ઠી સુધીના બ્રાહ્મી લિપિના પથ્થરમાં કંડારાયેલા નમૂના છે. આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું હતું ? - **કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ**

328. 'કજોડા' નાટકના લેખક...........છે. - **કેશવલાલ મોતીલાલ પરીખ**

329. રિખવદેવ જૈનોનો મેળો ક્યા ભરાય છે ? - **ભરૂચ**

330. રૂડીબાઈની વાવનું અન્ય પ્રચલિત નામ શું છે ? - **અડાલજની વાવ**

331. ગુજરાતનું.........સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે. - **દેવની મોરી**

332. તળાજા ગુફાઓ.......સમયની છે. - **મૌર્ય**

333. દેવની મોરીમાં મળી આવેલી મંજુષા.....ની બનેલી છે. - **ખડક**

334. ઝંડા ઝુલણ સાથે કઈ કલા જોડાયેલી છે ? - **ભવાઈ**

335. આ લોક ચિત્રોમાં મહિલા કલાકારોનો અનન્ય એકાધિકાર હોય છે અને તેમાં સાંકેતિક આકૃતિ જોવા મળે છે. ચિત્રો 2D પરિમાણ કારકતાવાળા હોય છે, તેના અંતરાયો આકૃતિ અને નકશીથી ભરવામાં આવે છે. આ ....ચિત્રકલા છે. - **મધુબની**

336. મણિયારા લોક સમુદાય તેમના........માટે જાણીતો છે. - **ઉત્તર પશ્ચિમ ભારતની સંગીત પરંપરા**

337. પાઉંડા, બહ્મો, ભાંડ, ઓજ-પલિ વિશેષ પ્રકારના ......છે. - **રંગમંચ સ્વરૂપ**

338. ક્યુ સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે ? - **સિદ્ધપુર**

339. નિર્ગ્રંથ યતિ સમુદાયના સ્થાપક કોણ હતા ? - **પાર્શ્વનાથ**

340. ક્યા રાજવીના શાસનકાળ દરમિયાન 1914માં વડોદરા ખાતે સૌપ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી ? - **મહારાજા સયાજીરાવ ગાયકવાડ**

341. યુનેસ્કો દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે, ભારતમાં અમદાવાદ સહિત કુલ કેટલા સ્થાનને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સમાવવામાં આવેલ છે ? - **36**

342. અમદાવાદ શહેરના વતની અને ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા ? - **પ્રિત્ઝકર એવોર્ડ**

343. ગુજરાતમાં ઘંટાકર્ણના મંદિર તરીકે ઓળખાય છે. - **મહુડી**

344. બોતેર કોઠાની વાવ કચ્છ જિલ્લામાં ક્યા આવેલી છે ? - **ભદ્રેશ્વર**

345. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિમંદિર' કોણે બંધાવ્યું હતું ? - **નાનજીભાઈ કાલીદાસ મહેતા**

346. કવિવર રવીન્દ્રનાથ ટાગોર લગભગ 17-18 વર્ષની વયે અમદાવાદ ખાતે અધ્યયન અને લેખન માટે છ-સાત માસ રોકાયા હતા. આ સ્થળનું નામ જણાવો. - **શાહીબાગ-મોતીશાહી મહેલ**

347. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ? - **આઈ.પી.દેસાઈ**

348. મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યા સ્થળે સૂર્યમંદિર આવેલું છે ? - **કોટાય**

349. એન્ટન ચેખોવની મૂળ વર્તા 'The bet'નો ડૉ.રમેશ ઓઝાએ ક્યા નામે અનુવાદ કર્યો છે ? - **શરત**

350. ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વના ત્રણ પ્રકારો આપ્યા છે. સાત્વિક, રાજસ અને........- **તામસ**

351. ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ? - **વલ્લભ મેવાડા**

352. 12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા ? - **વિપુલ કલ્યાણી**

353. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્યકલાકારનું નામ શું છે ? - **સોનલ માનસિંગ**

354. ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી ? - **ઈ.સ.1949**

355. ગુજરાતમાં ક્યા સ્થળે ભદ્રકાલી માતાનું મંદિર આવેલું છે ? - **પાવાગઢ**

356. ક્યા મહારાજાએ સંગીતની બેઠક માટે પિત્તળિયો બંગલો તરીકે ઓળખાતો બંગલો અલાયદો રાખ્યો હતો ? - **મહારાજા ભાવસિંહજી**

357. કુમાર મંગળસિંહજી, રવિશંકર પંડિત અને છગનલાલ જાદવ કોની સાથે સંલગ્ન હતા ? - **ચિત્રકલા**

358. ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય છે ? - **વેશગોર**

359. શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યા આવેલું છે ? - **કોબા (ગાંધીનગર)**

360. લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યા આવેલ છે ? - **ધરમપુર**

361. પાટણમાં એક વિશેષ 'અટક' ધરાવનારા લોકો માટીના રમકડાં બનાવવામાં નિષ્ણાત અને પ્રખ્યાત છે.એ લોકો કઈ અટક ધરાવે છે ? - **ઓતિયા**

362. દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ? - **ભાડભૂત (ભરૂચ)**

363. ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું વતન જણાવો. - **ધોળા જંક્શન**

364. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ? - **મોઢેરા**

365. ઘેરીયા ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ? - **સુરત (દુબળા)**

366. ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું ? - **2004**

367. નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે ? - **વાવના પ્રકાર**

368. મોઢેરા ખાતેના સૂર્યમંદિરને... ... છે. - **સંધારા આયોજન**

369. સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ/મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ? - **ત્રણ વિભાગો**

370. ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ? - **તારંગા**

371. ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ? - **જામા મસ્જિદ, અમદાવાદ**

372. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં... છે. - **અષ્ટ કોણીય મંડપ**

373. કેલીકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ? - **કાપડ**

374. ગુજરાતના પ્રવાસન સાથે ક્યો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે? - **ડાંગ ઉત્સવ**

375. 'પીથોરા' શું છે ? - **આદિવાસી ચિત્રકળો**

376. પારસીઓનું તીર્થસ્થળ ક્યું છે ? - **ઉદવાડા**

377. ડાંગની કથન-ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? - **થાળીકથા**

378. યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને 'ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર' તરીકે માન્યતા ક્યા વર્ષે આપી ? - **ઈ.સ.2017માં**

379. માઉન્ટ આબુ ખાતે આવેલ વિમલ વસહી અને લુના વસાહીના મંદિરોની ભાત......... દ્વારા કરવામાં આવી હતી. - **વસ્તુપાળ અને તેજપાળ**

380. હંસા મહેતા ગ્રંથાલય ક્યા આવેલું છે ? - **વડોદરા**

381. ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? - **વેદાંતી**

382. એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યા આવેલી છે ? - **સુરત**

383. વિખ્યાત ગઝલોના સર્જક શયામ સાધુનું પૂરું નામ જણાવો. - **શામળદાસ મૂળદાસ સોલંકી**

384. છેલિયા ગીતો ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ? - **રાજપીપળા**

385. ગુજરાતના ક્યા વિસ્તારમાં ટિપ્પણી નૃત્ય થાય છે ? - **ચોરવાડની કોળી બહેનો અને વેરાવળની ખારવણ બહેનો**

386. અમદાવાદમાં 'દર્પણ' એકેડમીની સ્થાપના કોણે કરી ? - **મૃણાલિની સારાભાઈ**

387. અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા ? - **બાલકૃષ્ણ દોશી**

388. નરસિંહ મહેતાએ હુંડીમાં કોનું નામ લખ્યું હતું ? - **ચતુર્ભુજ (વિષ્ણુ ભગવાન)નું**

389. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. - **ચાંગદેવ**

390. અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. - **સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ**

391. દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઈંટવા સ્તૂપ ક્યા રાજ્યમાંથી મળી આવેલ છે ? - **ગુજરાત**

392. સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની......... શૈલીનો છે. - **નાગર શૈલી**

393. મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે ? - **ઈરાની શૈલી**

394. મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યા ઉજવવામાં આવે છે ? - **ભરૂચ**

395. પાવરી અને તાડ્યું અથવા ડોબરું એ ક્યા પ્રકારના વાદ્યો છે ? - **સુષિર વાદ્યો**

396. ગોઠિયા ગીતો ક્યા વિસ્તાર સાથે જોડાયેલા છે ? - **ખેડબ્રહ્મા**

397. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ 'ભગવદગોમંડલ' ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ આ કોશના સંપાદનનું કાર્ય કેટલા સમય સુધીમાં પૂર્ણ કરાવ્યું હતું ? - **છવ્વીસ વર્ષ**

398. ગુજરાતી ભાષાનો એનસાયકલોપેડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય ક્યા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? - **ગોંડલ સ્ટેટના રાજવી**

399. ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક 'વીસમી સદી' કોણે શરૂ કર્યું હતું ? - **હાજી મહમ્મદ અલારખિયાએ**

400. ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? - **પંડિત ઓમકારનાથ**

401. ભીલ ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ? - **પંચમહાલ**

402. અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના ક્યા સંતની દરગાહ છે ? - **શેખ અહમદ ખટુગંજ બક્ષ**

403. મહાગુર્જરા શેની શૈલી છે ? - **મંદિર સ્થાપત્ય**

404. ગુજરાતના આદિવાસીઓ પૈકી દુબળાઓનું ક્યું નૃત્ય જાણીતું છે? - **હાલી નૃત્ય**

405. ક્યા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતાં પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા ? - **બદરુદ્દિન-અદ-દમમિ**

406. ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો. - **બાર્ટન મ્યુઝિયમ**

407. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સીનેગોગ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? - **અમદાવાદ**

408. 'મિથ્યાભિમાન'ના રચયિતા કોણ છે ? - **દલપતરામ**

409. બોમ્બે ગ્રીન થીયેટર ક્યા શહેરમાં સ્થિત છે ? - **મુંબઈ**

ભારતનો ઈતિહાસ

રેવન્યૂ તલાટી - 28/02/2016

1. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?
A)સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
B)સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
C)દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
D)'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

2. નીચેનામાંથી ક્યા 23 માં જૈન તીર્થંકર છે ?
A)મલિનાથ B)પાર્શ્વનાથ C)મહાવીર D)નોમીનાથ
3. ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?
A)દાદાભાઈ નવરોજી B)સર સી.શંકરનાયર
C)વ્યોમેશચન્દ્ર બેનરજી D)બદ્રુદીન તૈયબજી
4. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ?
A)સતલજ B)રવિ C)ગંગા D)જેલમ
5. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો?
A)સ્વદેશી મુવમેન્ટ B)દાંડી યાત્રા
C)ચંપારણ સત્યાગ્રહ D)ભારત છોડોઆંદોલન
6. "ધારવાડ સમય"કોને કહે છે ?
A)ટર્શયરી યુગના અંત ભાગને
B)આર્કિયન યુગના અંત ભાગને
C)જુરાસિક યુગના અંત ભાગને
D)પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

7. ક્યા યુગને ભારતના ઈતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે?
A)ગુપ્તયુગ B)મુગલ યુગ C)ચોલા યુગ D)અશોક યુગ

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

8. સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો.
A)કવિ કાલિદાસ B)પાણિની C)ભવભૂતિ D)ભર્તુહરિ
9. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો.
A)નરેન્દ્ર B)ગજેન્દ્ર C)મહેન્દ્ર D)નાગેન્દ્ર
10. 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ ઘોષણા ક્યા મહાપુરુષે કરી હતી ?
A)લાલા લજપતરાય B)સુભાષચંદ્ર બોઝ
C)સરદાર પટેલ D)વીર ભગતસિંહ
11. મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.
A)ભાસ્કરાચાર્ય B)સુશ્રુત
C)વરાહમિહિર D) ચરક
12. વિવેકાનંદ શિલા સ્મારક ક્યા રાજ્યમાં આવેલ છે ?
A)તમિલનાડુ B)કેરળ C)પશ્ચિમ બંગાળ D) દિલ્હી

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

13. ભારતના ક્યા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?
A)ગાયકવાડ B)મહારાણા પ્રતાપ
C)ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ D)પૃથ્વીરાજ ચૌહાણ
14. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?
A)નિક્સન B)ચેમ્સફર્ડ
C)લોર્ડ માઉન્ટબેટન D)ડેલહાઉસી
15. 'જયહિન્દ' સૂત્ર ક્યા રાજનેતાએ આપ્યું છે ?
A)ઈન્દિરા ગાંધી B)સુભાષચંદ્ર બોઝ
C)ગાંધીજી D)જવાહરલાલ નેહરુ
16. ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર ક્યા નેતાએ આપ્યું ?
A)સરદાર વલ્લભભાઈ પટેલ B)ગાંધીજી
C)સુભાષચંદ્ર બોઝ D)જવાહરલાલ નેહરુ
17. ભારતના ક્યા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ?
A)છત્રપતિ શિવાજી B)તાત્યા ટોપે
C)મહારાણા પ્રતાપ D)સંભાજી
18. ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?
A)સ્વતંત્ર ભારત સૈન્ય B)ભક્તિ સેના
C)આઝાદ ભારત સેના D)આઝાદ હિંદ ફોજ

1)B, 2)B, 3)C, 4)D, 5)C, 6)B, 7)A, 8)A, 9)A, 10)B, 11)A, 12)A, 13)B, 14)C, 15)B, 16)B, 17)A, 18)D.

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

19. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?
A) ખુદીરામ બોઝ B) સુખદેવ
C) બિસ્મિલ D) મદનલાલ ધિંગરા

20. નીતિશતકની રચના કોણે કરી છે ?
A) ભર્તુહરિ B) ભારવિ C) જયદેવ D) બિલ્હણ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

21. 'ઉજ્જૈન'નું પ્રાચીન નામ શું હતું ?
A) ઈન્દ્રાવતી B) રેવતી C) કર્માવતી D) અવંતિ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

22. ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?
A) લોકમાન્ય ટિળક B) જવારલાલ નેહરુ
C) રાજા રામમોહન રાય D) લાલા લજપતરાય

23. દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
A) ભગતસિંહ B) સાવરકર
C) ચંદ્રશેખર આઝાદ D) વાસુદેવ બળવંત ફડકે

GPSC પેપર - 1 - 2017

24. નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ?
A) મનુસ્મૃતિ B) અર્થશાસ્ત્ર C) નિતીસારા D) અષ્ટાધ્યાયી

25. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ?
A) ચીન B) બર્મા C) એનાટોલીઆ D) પર્શિયા

26. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?
A) સક્ય સંપ્રદાય B) ભાગવત સંપ્રદાય
C) શૈવ સંપ્રદાય D) સૌર સંપ્રદાય

27. અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ?
A) ભવભૂતી B) કાલીદાસ C) હરીસેના D) માઘ

28. ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને .... કહેવામાં આવતા હતાં.
A) પરદેશીકા B) ઉપારીકા C) રાજુકા D) મહામાત્ર

29. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી ક્યા બે મહત્ત્વના રાજકીય કેન્દ્રો હતા ?
A) પુરુશાપુરા અને મથુરા B) પુરુશાપુરા અને પાટલીપુત્ર
C) સરનાથ અને શ્રીનગર D) મથુરા અને સારનાથ

30. વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?
A) રવિકિર્તી B) બીલ્હાના C) મંગાલેસા D) ભાની

31. યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.

યાદી - I	યાદી - II
a) દેવેન્દ્રનાથ ટાગોર	i) માનવધર્મસભા
b) જ્યોતિબા ફૂલે	ii) તત્ત્વબોધીની સભા
c) દુર્ગારામ મહેતા	iii) દેવ સમાજ
d) શિવનારાયણ અગ્નિહોત્રી	iv) સત્યશોધક સભા

Codes :
A) a-i, b-iii, c-iv, d-ii B) a-ii, b-iv, c-i, d-iii
C) a-iii, b-ii, c-i, d-iv D) a-iv, b-iii, c-ii, d-i

32. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ?
A) લંડન B) સીંગાપોર C) પેરીસ D) સાન ફ્રાંસિસ્કો

33. નીચેની પૈકી ક્યા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે?
A) પ્રશ્ના B) ઈશા C) છંદોગ્ય D) કથા

34. જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા?
A) મુગ્ગાલીપટ્ટ તીસા B) આનંદ
C) ઉપાલી D) અનથપીંડદા

35. મલાયા ખાતે 'ઈન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.
A) મોહનસિંઘ B) રાસબેહારી બોઝ
C) સુભાષચંદ્ર બોઝ D) નિરંજનસિંઘ ગીલ

36. 'સયુરઘલ'નો અર્થ શું છે ?
A) વારસાઈ જમીન B) ભાડા રહીતની જમીન
C) વચેટીયાઓને અપાયેલી જમીન
D) પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન

37. થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ?
A) અડયાર B) પોંડીચેરી C) બેંગલોર D) પૂના

38. યાદી - I અને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

યાદી - I	યાદી - II
a) ઋગ્વેદ	i) ભજનોનો સંગ્રહ
b) અથર્વવેદ	ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
c) સામવેદ	iii) તંત્ર મંત્રનો સંગ્રહ
d) યજુર્વેદ	iv) બલિસૂત્રોનો સંગ્રહ

Codes :
A) a-ii, b-i, c-iv, d-iii B) a-iii, b-ii, c-i, d-iv
C) a-iv, b-ii, c-iii, d-i D) a-i, b-iii, c-ii, d-iv

19)C, 20)A, 21)D, 22)C, 23)D, 24)B, 25)D, 26)B, 27)C, 28)B, 29)A, 30)B, 31)B, 32)D, 33)C, 34)B, 35)A, 36)B, 37)A, 38)D.

39. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ?
A)સાંઘોલ B)રોપર C)લોથલ D)રાખીગરી

40. કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?
A)લોથલ B)ચન્હુદરો C)ધોળાવીરા D)મોહં-જો-દરો

41. જૈન ધર્મનો કયો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?
A)પુનઃજન્મ B)કર્મ
C)એકાત્મની હયાતી D)સ્યદવદા

42. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?
A)દુઃખ અને તેની નાબૂદી B)યોગ્ય કાર્ય
C)આખરી વાસ્તવિકતા D)મુક્તિ

43. 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?
A)અલાઉદ્દીન ખીલજી B)મોહંમદ તઘલક
C)ફિરુઝ તઘલક D)મુબારક ખીલજી

44. નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?
A)વિજયનગર રાજ્યતંત્રનું B)કાકડીયા રાજ્યતંત્રનું
C)હોયસાલ રાજ્યતંત્રનું D)બહામણી રાજ્યતંત્રનું

45. ગોપાલકૃષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા?
A)સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી
B)રોયલ કમીશન ઓન ઈન્ડિયન લેબર
C)રોયલ કમીશન ઓન પબ્લીક સર્વીસીસ ઈન ઈન્ડિયા
D)ડેક્કન એજ્યુકેશન સોસાયટી

46. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?
A)રાજરાજા ચોલા B)રાજેન્દ્ર ચોલા
C)રાજાધીરાજ ચોલા D)કુલોત્તુંગ ચોલા

47. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
A)નેમીનાથ - કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિસ્થનેમિ
B)મલ્લિનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
C)પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
D)અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી

48. નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?
A)મોહેં-જો-દરો B)હડપ્પા
C)ધોળાવીરા D)મેહરગઢ

49. અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?
A)નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
B)અભિનેતાઓ, ગાયકો અને ગણીકાઓ પર
C)રાજ્યની જમીનમાં વાવણી પર
D)સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

50. વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ?
A)જેલમ B)રાવી C)ઘગ્ગર-હાકરા D)સતલજ

51. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?
A)વીરસેન સબા (Virsena saba) B)હરીશેના (Harishena)
C)પર્ણદત્તા (Parnadatta) D)ચક્રપલિતા (Chakrapalita)

52. ક્યા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો?
A)ચંદ્રગુપ્ત-I B)ચંદ્રગુપ્ત - II
C)સમુદ્રગુપ્ત D)કુમારગુપ્ત - I

53. કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?
A)મહાબોધી મઠ B)સારનાથ મઠ
C)સ્થાનવિશ્વર મઠ D)જલંધર મઠ

54. નીચેના પૈકી ક્યું જૈન લખાણ નથી ?
A)આચારાંગ સૂત્ર B)સૂત્રક્રીતંગ
C)કલ્પસૂત્ર D)વિશુદ્ધીમાગા

55. નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
Codes :
A)2, 1, 4 અને 3 B)4, 2, 3 અને 1
C)3, 1, 4 અને 2 D)1, 2, 4 અને 3

56. મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના .... ને "પેજ આફટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" ("page after page of thinly disguised official whitewash") કહ્યો.
A)સાઈમન કમીશન B)હન્ટર કમીશન
C)અચીસન કમીશન D)ઉપરના પૈકી કોઈ નહીં

57. તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.
A)નટરાજ B)બુદ્ધ
C)તીર્થંકર D)મહીસાસુર મર્દીની

GPSC MAINS પેપર - 1 - 2016

58. 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ?
A)1948 B)1949 C)1950 D)1951

59. 'અમર ગુર્જર'નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ?
A)કાયદો વ્યવસ્થા B)મહેસૂલ
C)લશ્કર D)ઉપરના તમામ

60. 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?
A)એમ.એલ.દાંતવાલા B)દાદાભાઈ નવરોજી
C)પી.ડી.ઓઝા D)બી.એસ.મીન્હાસ

39)D, 40)D, 41)D, 42)A, 43)B, 44)A, 45)B, 46)B, 47)C, 48)D, 49)D, 50)A, 51)A, 52)C, 53)A, 54)D, 55)B, 56)B, 57)A, 58)D, 59)B, 60)B.

61. 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી ક્યા કાર્યો કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?
A)વેરો ઉઘરાવવો B)કાયદા અને વ્યવસ્થાની જાળવણી
C)જેલનું સંચાલન D)ન્યાયિક કાર્યો

GPSC MAINS પેપર - 2 - 2016

62. બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?
A)આર્ય અષ્ટાંગીક માર્ગ B)ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
C)બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો D)ઉપરના પૈકી કોઈ નહી
63. જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે:
A)સત્ય B)અહિંસા C)અસ્તેય D)શાંતિ
64. બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :
A)પીડાનું અસ્તિત્વ B)પીડાનું કારણ
C)પીડાનો અંત D)પીડાના અંત માટેનો પથ
65. 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :
A)જૈન ધર્મગ્રંથ B)બૌદ્ધ ધર્મગ્રંથ
C)હિન્દુ ધર્મગ્રંથ D)શીખ ધર્મગ્રંથ
66. 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહી જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે?
A)સ્વામી દયાનંદ સરસ્વતી B)સ્વામી વિવેકાનંદ
C)સ્વામી રામકૃષ્ણ પરમહંસ D)રાજા રામમોહન રાય
67. નીચેનમાંથી કોણે 'વેદો તરફ પાછા વળો'નાં નારો આપ્યો
A)દયાનંદ સરસ્વતી B)કબીર
C)મહાત્મા ગાંધી D)સ્વામી વિવેકાનંદ

કોમર્શિયલ ટેક્સ ઇન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

68. લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ?
A)મંદિર B)પક્ષી C)ચર્ચ D)બૌદ્ધ મઠ
69. દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?
A)ફિરોઝશાહ B)શેરશાહ C)કુત્બુદ્દીન D)જલાલુદ્દીન
70. વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ?
A)સર જહોન લૉરેન્સ B)એડમિરલ વોટસન
C)જનરલ આયર કૂટ D)કાઉન્ટ ડી લેલી
71. ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ?
A)રાજગૃહા B)પાટલીપુત્ર C)વૈશાલી D)કાશ્મીર
72. રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?
A)લોર્ડ નોર્થ B)લોર્ડ મેયો
C)લોર્ડ એક્ટન D)સર વિલિયમ જોન્સ
73. ગોવિંદ-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ ક્યા વંશના હતા?
A)ચાલુક્ય B)પાલ C)ગુર્જર-પ્રતિહાર D)રાષ્ટ્રકુટ
74. વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?
A)5મી સપ્ટેમ્બર, 1946 B)2જી સપ્ટેમ્બર, 1946
C)2જી ઓક્ટોબર, 1946 D)1લી ઓગસ્ટ, 1946
75. 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?
A)શ્યામજીકૃષ્ણ વર્મા B)લાલા લજપતરાય
C)દાદાભાઈ નવરોજી D)સુરેન્દ્રનાથ બેનરજી
76. ક્યા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?
A)લોર્ડ રિપન B)લોર્ડ મેયો
C)લોર્ડ લીટન D)લોર્ડ નોર્થબ્રુક
77. ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક ક્યા વર્ષમાં થઈ હતી ?
A)ઈ.સ.1908 B)ઈ.સ.1905 C)ઈ.સ.1907 D)ઈ.સ.1906
78. ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું?
A)સતારા B)વરાડ પ્રાંત C)અવધ D)તાંજોર
79. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?
A)પોર્ટુગીઝ (ફિરંગી) B)ડચ (વલંદાઓ)
C)ડેનિશ (ડેન્માર્કની) D)બ્રિટીશ (અંગ્રેજ)
80. વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી ક્યા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ?
A)હોલકર B)ગાયકવાડ C)કર્ણાટક D)મૈસુર

PSI GK - 1/1/2017

81. ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ?
A)ઋગવેદ B)યજુર્વેદ C)સામવેદ D)અથર્વવેદ
82. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ?
A)અકબર B)હુમાયુ C)શાહજહા D)ઔરંગઝેબ
83. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?
A)અકબર B)જહાંગીર C)શાહજહાં D)ઔરંગઝેબ
84. 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
A)લોર્ડ કર્ઝન B)લોર્ડ મિન્ટો
C)લોર્ડ વેવેલ D)લોર્ડ ડેલહાઉસી
85. ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
A)એટલી B)રૂઝવેલ્ટ C)ચર્ચિલ D)માઉન્ટ બેટન
86. ગીત ગોવિંદના લેખક કોણ હતા ?
A)કબિર B)કાલિદાસ C)રવિદાસ D)જયદેવ

61)D, 62)A, 63)B, 64)D, 65)A, 66)A, 67)A, 68)D, 69)A, 70)C, 71)B, 72)A, 73)D, 74)B, 75)C, 76)A, 77)D, 78)B, 79)A, 80)C, 81)D, 82)C, 83)B, 84)A, 85)A, 86)D.

87. ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
A)ડબલ્યુ.સી.બેનર્જી B) એ.ઓ.હ્યુમ
C)એની બેસન્ટ D)વિઠ્ઠલભાઈ પટેલ

88. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?
A)પોટેશિયમ-8 ડેટીંગ B) કાર્બન-8 ડેટીંગ
C)પોટેશિયમ-14 ડેટીંગ D) કાર્બન-14 ડેટીંગ

89. ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો ?
A)મધ્ય પ્રદેશ B)ઉત્તર પ્રદેશ C) બિહાર D)હરિયાણા

PSI GK - 4-3/5-3/2017

90. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના ક્યા રાજ્યમાં આવે છે?
A)ઉત્તરપ્રદેશ B)બિહાર C) ઝારખંડ D) મધ્યપ્રદેશ

91. તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે ક્યા રાજ્યના હતાં?
A)હિમાચલ પ્રદેશ B) મણિપુર
C) મેઘાલય D)ત્રિપુરા

92. ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી ?
A)વાસ્કો દ ગામા B) કોલમ્બસ
C)મેગલન D)સર હોપકિન્સ

93. પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?
A)બિહાર B)આંધ્ર પ્રદેશ C) ઓરિસા D) પશ્ચિમ બંગાળ

94. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા ?
A)લોર્ડ કેનીંગ B) લોર્ડ ડફરીન
C)લોર્ડ મેયો D) લોર્ડ એલ્જીન

95. નીચેનામાંથી શેર એ પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?
A)ભગતસિંહ B) લાલા લજપતરાય
C)ચંદ્રશેખર આઝાદ D) લાલા હરદયાલ

96. .... માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું.
A)INCનું 1896 સત્ર B) INCનું 1912 સત્ર
C)INCનું 1927 સત્ર D) INCનું 1942 સત્ર

97. ભારતનાં સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે?
A) 12 સેકન્ડ B) 15 સેકન્ડ C) 20 સેકન્ડ D) 26 સેકન્ડ

કોન્સ્ટેબલ - 23/10/2016

98. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?
A)રાજારામ મોહનરાયે B) સ્વામી રામકૃષ્ણ
C)સ્વામી વિવેકાનંદ D)સ્વામી દયાનંદ સરસ્વતી

99. સન્ 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?
A)અકબર તથા હેમૂ વચ્ચે
B)રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે
C)બાબર તથા હેમૂ વચ્ચે
D)બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે

100. 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ?
A)ચંડીગઢમાં B)અમૃતસરમાં
C)જાલંધરમાં D)પઠાણકોઠમાં

101. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?
A)બાલ ગંગાધર તિલક B) મદન મોહન માલવીય
C)એની બીસેંટ D)સરદાર પટેલ

102. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
A)વિલિયમ બેન્ટિક B) લોર્ડ વિલિંગ્ડન
C)લોર્ડ મેકાલે D)લોર્ડ હેસ્ટીંગ્જ

103. ભારતમાં 'થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી?
A)સ્વામી વિવેકાનંદ B)બાલ ગંગાધર તિલક
C)એની બીસેંટ D)મહર્ષિ અરવિંદ

104. 'ઈન્ડિકા' પુસ્તકના રચયિતા છે -
A)કૌટિલ્ય B)હ્યુએનત્સાંગ C)ફાહ્યાન D)મેગેસ્થનીજ

105. 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?
A)દિલ્લી-મુંબઈ B) મુંબઈ-થાણે
C)મુંબઈ-પુણે D)દિલ્લી-અમદાવાદ

106. 'ભારતની પ્રજા અતિ પ્રાચિન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?
A)કુટુંબ પ્રેમથી B) ઉત્સવ પ્રેમથી
C)દેશ પ્રેમથી D)વૃક્ષ પ્રેમથી

107. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો?
A)માટીમાંથી B)અકીકમાંથી C)પથ્થરમાંથી D)લાકડામાંથી

કોન્સ્ટેબલ - 2015

108. 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'નું સૂત્ર કોણે આપ્યું?
A)રામકૃષ્ણ પરમહંસ B) સ્વામી વિવેકાનંદ
C) દયાનંદ સરસ્વતી D) રાજા રામમોહન રાય

109. યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ 1) દયાનંદ સરસ્વતી
Q)આર્ય સમાજ 2) ઠક્કર બાપા
R) વહાબી આંદોલન 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
S) પંચમહાલ ભીલ સેવા મંડળ 4) રાજા રામમોહન રાય
A) P-2, Q-3, R-1, S-4 B) P-3, Q-2, R-4, S-1
C) P-4, Q-1, R-2, S-3 D) P-4, Q-1, R-3, S-2

87)A, 88)D, 89)C, 90)B, 91)C, 92)A, 93)D, 94)B, 95)B, 96)A, 97)C, 98)C, 99)D, 100)B, 101)B, 102)A, 103)C, 104)D, 105)B, 106)D, 107)A, 108)B, 109)D.

110. 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?
A) વીર સાવરકર B) મેડમ ભીખાઈજી કામા
C) રાણા સરદારસિંહ D) શ્યામજીકૃષ્ણ વર્મા

111. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ?
A) જવાહરલાલ નેહરૂ B) રાજેન્દ્ર પ્રસાદ
C) સરદાર વલ્લભભાઈ પટેલ D) ડૉ. ભીમરાવ આંબેડકર

112. 'પંચતંત્ર'ના રચયિતા કોણ છે ?
A) કાલિદાસ B) વિષ્ણુશર્મા C) પાણિની D) ચાણક્ય

113. સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ?
A) બારડોલી B) ધરાસણા C) ચંપારણ D) દિલ્હી

114. ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી ?
A) સુરત B) ભરૂચ C) વડોદરા D) અમદાવાદ

બિન સચિવાલય કલાર્ક - 2016

115. "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ"એમ કોણે કહ્યુ છે ?
A) મનુ B) પરાશર C) કૌટિલ્ય D) બૃહસ્પતિ

GPSC પ્રિલિમ - 2001

116. "ભૂદાન યોજના" સાથે ક્યા મહાનુભાવનું નામ સાંકળીશું ?
A) મહાત્મા ગાંધી B) જમનાદાસ બજાજ
C) બાબા આમ્ટે D) વિનોબા ભાવે

GPSC પ્રિલિમ - 2007

117. કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ?
A) પંજાબ B) ઉત્તરપ્રદેશ C) હરિયાણા D) ઉત્તરાંચલ

118. રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?
A) સોશ્યાલીસ્ટ પાર્ટી B) જનસંઘ
C) કોંગ્રેસ D) સ્વતંત્ર પાર્ટી

119. ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી?
A) રાજકોટ B) પોરબંદર C) ભાવનગર D) જામનગર

120. સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્હી'નો નારો કોણે આપ્યો હતો?
A) મહાત્મા ગાંધી B) સરદાર પટેલ
C) જવાહરલાલ નહેરૂ D) નેતાજી સુભાષચંદ્ર બોઝ

121. સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?
A) જતીન B) લાલા લજપતરાય
C) સુખદેવ D) નેતાજી સુભાષચંદ્ર બોઝ

122. 'વંદે માતરમ્'ના રચિયતા કોણ ?
A) રવીન્દ્રનાથ ટાગોર B) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
C) શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય D) આમાંના કોઈ નહીં

123. INA (ઈન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી ?
A) બર્મા B) જર્મની C) થાઈલેન્ડ D) અફઘાનિસ્તાન

124. "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈં"ના લેખક કોણ?
A) હસરત મોહાની B) ઈકબાલ
C) અકબર ઈલાહાબાદી D) રામપ્રસાદ બિસમીલ

125. બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ?
A) દિલ્લી B) આગ્રા C) ફતેહપુર સિક્રી D) લખનૌ

126. હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેરની નજીક છે ?
A) જયપુર B) અજમેર C) ઉદયપુર D) જોધપુર

127. નીચેનામાંથી ક્યું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી?
A) રાજકોટ B) ચોરીચૌરા C) વર્ધા D) જામનગર

128. આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?
A) નંદદલાલ બોઝ B) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
C) રવીન્દ્રનાથ ટાગોર D) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

129. ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
A) વિન્સ્ટન ચર્ચીલ B) એડન
C) એટલી D) ચેમ્બરલેન

GPSC પ્રિલિમ - 2014

130. ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?
A) ક્રિપ્સ મિશન - 1940
B) કેબિનેટ મિશન યોજના - 1944
C) સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
D) બીજી ગોળમેજી પરિષદ - 1936

131. ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?
A) શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર
B) શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો
C) શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો
D) શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન

132. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો?
A) 10 ડિસેમ્બર, 1829 B) 11 જુલાઈ, 1832
C) 4 ઓગસ્ટ, 1811 D) 8 એપ્રિલ, 1829

133. ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા?
A) સર આયરકૂટ B) લોર્ડ વેલેસ્લી
C) લોર્ડ વોરન હેસ્ટિંગ્સ D) લોર્ડ વિલિયમ બેન્ટિક

110)B, 111)C, 112)B, 113)C, 114)A, 115)C, 116)D, 117)C, 118)A, 119)A, 120)D, 121)C, 122)B, 123)A, 124)D, 125)C, 126)C, 127)D, 128)C, 129)C, 130)C, 131)D, 132)B, 133)B.

134. ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ?
A) દમણ B) ગોવા C) દીવ D) કરાઈકલ

135. "न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते ।" - અર્થાત્ 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.' - આ સુવાક્યનો ઉલ્લેખ ક્યા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?
A) વાલ્મિકી રામાયણ B) માંડુક્ય ઉપનિષદ
C) મનુસ્મૃતિ D) શ્રીમદ્ ભગવદ્ગીતા

PSI/ASI GK - 2/5/2015

136. બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ?
A) મુંબઈ B) ચેન્નાઈ C) દિલ્હી D) કલકત્તા

137. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?
A) બિંદુસાર B) ચંદ્રગુપ્ત C) કૌટીલ્ય D) ધનનંદ

138. ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?
A) રાણા ઉદયસિંહ B) રાણા સાંગા
C) મહારાણા પ્રતાપ D) રાણા કુમ્ભા

139. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરીચય ન હતો ?
A) સોનું B) તાંબુ C) ચાંદી D) લોખંડ

140. શહેનશાહ અકબરે ક્યા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા?
A) આમેર B) આગ્રા C) અજમેર D) બીકાનેર

141. કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ?
A) મગધ B) કાશી C) ઉજ્જૈન D) અવધ

142. માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ ક્યા યુગમાં થયો ?
A) પ્રાચીન પાષણ યુગ B) લોહ યુગ
C) તામ્રકાસ્ય યુગ D) નુતન પાષણ યુગ

143. રેનેસો શું છે ?
A) નવજાગૃતિ આંદોલન B) કર્મયુદ્ધ
C) ધર્મયુદ્ધ D) નવસર્જન આંદોલન

144. હ્યુ એન સંગ ક્યા દેશનો પદયાત્રી હતો ?
A) ભૂતાન B) ચીન C) બર્મા D) કોરીયા

145. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ?
A) ચૈત્ર B) પોષ C) કારતક D) ફાગણ

146. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ?
A) બૌદ્ધ B) હિન્દુ C) શીખ D) જૈન

147. બંકિમચંદ્રનું 'વંદેમાતરમ' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?
A) ચંપારણ સત્યાગ્રહ B) દાંડીકૂચ
C) હિંદુછોડો લડત D) બંગભંગની લડત

148. ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?
A) વિનોબા ભાવેએ B) દાદાભાઈ નવરોજીએ
C) ગાંધીજીએ D) લોકમાન્ય ટિળકે

149. શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?
A) દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ B) ચંપારણનો સત્યાગ્રહ
C) અમદાવાદનો સત્યાગ્રહ D) ખેડા સત્યાગ્રહ

150. સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ?
A) બ્રાહ્મી B) ખરોષ્ઠિ
C) ઈરાની D) હજુ લીપી ઓળખાઈ નથી

151. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
A) કુતુબુદ્દીન બખ્તિયારે B) કુતુબુદ્દીન ઐબક
C) શિહાબુદ્દીન ઘોરી D) મહમૂદ ગઝનવીએ

GPSC Class-1 - 2016

152. હરપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે?
A) સિંધુ B) રાવિ C) ઘાઘર (સરસ્વતી) D) બિયાસ

153. બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?
A) ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
B) એક સ્થળેથી બીજા સ્થળે જવું
C) ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
D) ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું

154. મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થંકર હતાં ?
A) સુમતિનાથ B) નેમિનાથ C) શાંતિનાથ D) પાર્શ્વનાથ

155. નીચેના પૈકી ક્યા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ?
A) કિલ્લો B) મિત્ર C) તિજોરી D) કરવેરા

156. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?
A) પાટલીપુત્ર B) ઉજ્જૈન C) શલાતુર D) તક્ષશિલા

157. બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?
A) ગિરનાર B) સાહગૌરા C) અનુરાધાપુર D) પિરવા

158. મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
A) પંડિત માધો સરૂપ વત્સ B) રાખલદાસ બેનરજી
C) દયારામ સહાની D) એચ.ડી.સાંકલીયા

GPSC Class - 2 - 29/1/2017

159. સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા?
A) સોનુ B) ચાંદી C) તાંબુ D) સીસુ

160. નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો?
A) શાતવાહન B) મૈત્રક C) ચાલુક્ય D) રાષ્ટ્રકુટ

134)D, 135)D, 136)D, 137)A, 138)D, 139)D, 140)A, 141)A, 142)D, 143)D, 144)B, 145)A, 146)D, 147)D, 148)D, 149)D, 150)D, 151)B, 152)C, 153)C, 154)D, 155)D, 156)C, 157)C, 158)B, 159)A, 160)C.

161. નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે?
A)યજુર્વેદ B) અથર્વવેદ
C)સતપથ બ્રાહ્મણ D) માંડુક્ય ઉપનિષદ

162. સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા?
A)તાંબુ, ચાંદી, સોના B) તાંબુ, ચાંદી, ચાંદી
C)ચાંદી, સોનુ, ચાંદી D)સોનુ, કોપર, સીસું

163. મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા?
A)અકબર B)શાહજંહા C) ઔરંગઝેબ D)હુમાયુ

164. ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે?
A)પ્રથમ B)ચોથા C)સાતમા D)દસમા

165. પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં (Mehrgarh-Mehergwrh) કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો?
A)જવ B)ડાંગર C) ઘઉં D)તલ

166. લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો?
A)બિંબિસાર B) અજાતશત્રુ
C)ચન્દ્રગુપ્ત મૌર્ય D)ચન્દ્રગુપ્ત - પહેલો

167. કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.
1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો
A)2, 1, 4, 3 B)4, 2, 1, 3 C) 2, 4, 1, 3 D)4, 2, 3, 1

168. વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.
1) ઘીજીંગ - (I-Tsing)
2) સુંગયુન - (Sung yun)
3) હ્યુ એન સંગ - (Huiian - Tsang)
4) ફાહિયાન - (Fa-Hien)
A)3, 4, 2, 1 B)4, 2, 3, 1 C) 1, 3, 2, 4 D)3, 1, 2, 4

169. ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓનાં સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી?
A)ગરબડદાસ મુખી B) સુરજમલ
C)મુળુ માણેક D) નારાયણ હેમચંદ્ર

170. કયા યુદ્ધમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો?
A) પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ B) પાણીપતનું યુદ્ધ
C) બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ D) ગુજરાત યુદ્ધ

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

171. નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા?
A)લખનઉ, 1996 B) લાહોર, 1929
C)કલકત્તા, 1917 D)બેલગાંવ, 1924

172. સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે.......
A)સિમલા એક પર્યટન સ્થળ તરીકે
B)સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે
C)ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે
D)ઉપરના પૈકી કોઈ નહી

173. ચાણક્યનું સાચું નામ શું હતું?
A)વિષ્ણુ ગુપ્ત B) રામતનું મિશ્રા
C) કૌટિલ્ય D)વિશિષ્ટ

174. વાસ્કો-દ-ગામાં ભારતમાં ક્યારે આવ્યો?
A) 1442 B) 1494 C) 1496 D) 1498

175. આઝાદ હિન્દ ફોજની રચના કોની મદદથી થઈ હતી?
A)યુ.એસ.એ. B) રશિયા C) જાપાન D) ચીન

176. ટીપુ સુલ્તાન કોનો રાજવી હતો?
A)બંગાળ B) કર્ણાટક C) હૈદ્રાબાદ D) મૈસૂર

177. રામચરિતમાનસના લેખક કોણ છે?
A)તુલસીદાસ B) કાલીદાસ C) કબીર D) રવિદાસ

178. બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે?
A)સંસ્કૃત B) તામીલ C) પ્રાકૃત D) પાલી

179. દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે?
A)અશોક B)ચંદ્રગુપ્ત મૌર્ય
C)સમુદ્રગુપ્ત D)ચંદ્રગુપ્ત - 2

180. વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે?
A)મુંબઈ B) કલકત્તા C) દિલ્હી D)ચેન્નાઈ

181. ઈ.સ.1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?
A)સુભાષચંદ્ર બોઝ B) શ્યામજીકૃષ્ણ વર્મા
C) મેડમ કામા D) જતીન દાસ

182. ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતો નો સ્વીકાર કરવામાં આવ્યો?
A)ચીન B) રશિયા C) મોરેશિયસ D) શ્રીલંકા

GPSC Class - 2 - 18/12/2016

183. મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ' ને બદલે 'ધમ્મઘોષ'ની નીતિ અપનાવી હતી?
A)બિંબિસાર B) બિંદુસાર C) અશોક D) અજાતશત્રુ

184. અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા?
A) ઈક્તાદાર B) ખુસરૌ C) શાહના D) ટંકા

161)D, 162)B, 163)C, 164)D, 165)A, 166)B, 167)C, 168)B, 169)D, 170)C, 171)D, 172)C, 173)A, 174)D, 175)C, 176)D, 177)A, 178)D, 179)D, 180)B, 181)C, 182)A, 183)C, 184)C.

185. હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો?
A) ફિરોજશાહ તુઘલખ B) અલાઉદ્દિન ખિલજી
C) બલ્બન D) ઉપરોક્ત એક પણ નહી

186. 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે?
A) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર B) ભોળાનાથ સારાભાઈ દિવેટીયા
C) ગાંધીજી D) રાજા રામમોહન રાય

187. સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમ્યાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા?
A) ડેવીડ હેર B) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
C) હેનરી દેરોઝિયા D) ઉપરોક્ત એક પણ નહી

188. ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ ક્યો સત્યાગ્રહ થયો હતો?
A) બારડોલી સત્યાગ્રહ B) ખેડા સત્યાગ્રહ
C) નાગપુર સત્યાગ્રહ D) ચંપારણ સત્યાગ્રહ

189. ઈ.સ.1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા?
A) ગોપાલકૃષ્ણ ગોખલે B) ગોપાલ હરિ દેશમુખ
C) સુભાષચંદ્ર બોઝ D) ગાંધીજી

190. કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં ક્યા સ્થળે થયું હતું
A) આગાખાન મહેલ B) આગાખાન પાર્ક
C) આલ્ફ્રેડ પાર્ક D) ઉપરોક્ત એક પણ નહી

191. ક્યા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લીમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું?
A) ખેડા સત્યાગ્રહ
B) કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)
C) ખિલાફત આંદોલન D) ઉપરોક્ત એક પણ નહી

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

192. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?
A) કલ્પસૂત્ર B) ભગવદ્ગીતા
C) ત્રિપિટક D) સારિપુત્ર પ્રકરણ

193. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ ક્યો છે?.
A) તારીખ-ઈ-ફિરોઝશાહી B) બાબરનામા
C) આયને-અકબરી D) તવારીખ-એ-ગુજરાત

194. ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે?
A) ચરક અને સુશ્રુત B) આર્યભટ્ટ
C) ભાસ્કરાચાર્ય D) બ્રહ્મગુપ્ત

195. મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દિકરી..........?
A) વિમળા B) ભારાણી C) બ્રાહ્મી D) શકુંતલા

196. ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજયો તથા બ્રિટીશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ ક્યા વર્ષમાં યોજાઈ હતી?
A) 1930 B) 1931 C) 1932 D) 1935

197. ક્યા બળવાના બીજે જ દિવસે બ્રિટીશ સરકારે કેબીનેટ મિશનની જાહેરાત કરી હતી?
A) 1857 નો બળવો B) મુંબઈના નૌકા સૈન્યનો બળવો
C) ચેન્નઈનો બળવો D) કલકત્તાનો બળવો

198. ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર ક્યું હતું?
A) હિન્દ ન્યૂઝ B) પંજાબ કેસરી
C) ધી ઈન્ડિયા D) બેંગોલ ગેઝેટ

199. વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં?
A) મૌલાના આઝાદ B) ખાન અબ્દુલ ગફારખાન
C) સૈયદ અહમદ બરેલવી D) લિયાકત અલી

200. રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું?
A) જવાહરલાલ નહેરૂ B) મદનમોહન માલવિયા
C) ગાંધીજી D) શ્રીમતી એની બેસેન્ટ

201. "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે?
A) લાલા લજપતરાય B) રાજા રામમોહન રાય
C) શહીદ ભગતસિંહ D) બી.જી.તીલક

202. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા?
A) આનંદ મોહન બોઝ B) ડબલ્યું.સી.બેનરજી
C) એ.ઓ.હ્યુમ D) વિલિયમ એડમ

GPSC Class - 2 - 12/2/2017

203. યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.

1) પાણીપતનું ત્રીજુ યુદ્ધ	A) 1814-16
2) પ્લાસીનું યુદ્ધ	B) 1761
3) ત્રીજી કર્નાટિક વોર	C) 1757
4) એંગ્લો-ગુરખા વોર	D) 1756-1763

A) 1 -D, 2 -A, 3 -B, 4 -C B) 1 -C, 2 -D, 3 -A, 4 -B
C) 1 -B, 2 -C, 3 -D, 4 -A D) 1 -A, 2 -B, 3 -C, 4 -D

204. 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.

1) દિલ્હી	A) રાણી લક્ષ્મીબાઈ
2) લખનઉ	B) ખાન બહાદુર ખાન
3) ઝાંસી	C) નાનાસાહેબ, તાત્યા ટોપે
4) બરેલી	D) બહાદુર શાહ જફર બીજો

A) 1 -A, 2 -B, 3 -D, 4 -C B) 1 -C, 2 -A, 3 -B, 4 -D
C) 1 -D, 2 -C, 3 -A, 4 -B D) 1 -B, 2 -A, 3 -C, 4 -D

185)A, 186)D, 187)B, 188)D, 189)C, 190)A, 191)C, 192)C, 193)C, 194)A, 195)C, 196)A, 197)B, 198)D, 199)A, 200)B, 201)B, 202)C, 203)C, 204)C.

205. "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું?
A) ગુપ્ત કાળ દરમ્યાન
B) ચોલા કાળ દરમ્યાન
C) વિજયનગર સામ્રાજ્ય દરમ્યાન
D) મરાઠા કાળ દરમ્યાન

206. મોગલ સામ્રાજયમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું?
A) કાલીકટ B) ભરૂચ C) ખંભાત D) સુરત

GPSC Class - 2 - 28/1/2017

207. હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી?
A) ટેરાકોટા (Terracotta) B) તાંબું (Copper)
C) લોખંડ (Iron) D) સીસું (Lead)

208. "India has to unite and conquer the whole world once again with it's might" આ વાકય કોનું છે?
A) સ્વામી વિવેકાનંદ B) રામકિષ્ણ પરમહંસ
C) સ્વામી દયાનંદ D) જવાહર લાલ નહેરૂ

209. વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે?
A) સિંધુ B) ગંગા C) સરસ્વતી D) નર્મદા

210. નીચેના પૈકી કોને બ્રિટીશ સરકારે ઈન્ડીયન સીવીલ સર્વીસ (Indian Civil Service) માંથી બરતરફ (Dismissed) કરવામાં આવેલ હતા?
A) સરદાર વલ્લભભાઈ પટેલ B) સુરેન્દ્રનાથ બેનરજી
C) આર.સી.દત્ત D) સુભાષ ચંદ્ર બોઝ

GPSC Class-1 - 15/01/2017

211. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?
A) શ્રીમતી એની બેસન્ટ B) શ્રીમતી સરોજીની નાયડુ
C) શ્રીમતી નેલી સેનગુપ્તા D) અરૂણા અસફ અલી

212. નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે?
A) સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ B) લોરિયા - નંદનગઢ સ્તૂપ
C) તક્ષશીલા - ધર્મરાજિકા સ્તૂપ D) નાગાર્જુન - કોંડાનો સ્તૂપ

213. ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?
A) ગુપ્તકાળ B) સાતવાહન બંશ
C) અનુમૌર્યયુગ D) મૌર્યયુગ

214. કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાઈ છે?
A) બૃહદેશ્વર મંદિર B) મોઢેરાનું સૂર્યમંદિર
C) કોણાર્કનું સૂર્યમંદિર D) હજાર-રામ મંદિર

215. દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે?
A) તેલુગુ B) કન્નડ C) મલયાલમ D) તામિલ

216. મોગલ બાદશાહ બાબરે "તુઝકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી?
A) અરબી B) તુર્કિ C) ફારસી D) ઉર્દૂ

217. નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે?
A) અશ્વઘોષ - બુદ્ધચરિત B) પાણિની - અષ્ટાધ્યાયી
C) કાલિદાસ - રઘુવંશ D) હુમાયુનામા - અકબર

218. અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો?
A) દિલ્હી B) આગ્રા
C) ફતેહપુર સિક્રી D) અલ્હાબાદ

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

219. બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ?
A) લોર્ડ મેકોલે B) ચાર્લ્સ વુડ
C) લોર્ડ વિલિયમ બેન્ટિક D) રાજા રામમોહનરાય

220. "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ?
A) આચાર્ય વિનોબા ભાવે B) ગાંધીજી
C) ખાન અબ્દુલ ગફારખાન D) ઝવેરચંદ મેઘાણી

221. ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં કયાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?
A) શ્રીલંકા B) બાંગ્લાદેશ C) પાકિસ્તાન D) ચીન

222. હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ?
A) રાવી B) બિયાસ C) ચિનાબ D) સતલુજ

223. બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ?
A) ભિક્ષુ B) ધર્મ C) સંઘ D) બુદ્ધ

224. વૈદયુગમાં નીચે પૈકી કયું સંપતિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ?
A) ગોધન B) સોનું C) જમીન D) મકાન

225. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યાં હતાં ?
A) સમુદ્રગુપ્ત B) સ્કંદગુપ્ત C) કુમારગુપ્ત D) ભાનુગુપ્ત

226. કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં?
A) મુઘલ - મરાઠા B) અંગ્રેજ - ફ્રેન્ચ
C) અંગ્રેજ - ડચ D) અંગ્રેજ - મરાઠા

227. "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ?
A) કર્ઝન B) કલાઈવ C) વેલેસ્લી D) કોર્નવોલિસ

205)D, 206)D, 207)A, 208)A, 209)A, 210)B, 211)A, 212)C, 213)A, 214)C, 215)D, 216)B, 217)D, 218)C, 219)B, 220)A, 221)D, 222)A, 223)A, 224)A, 225)B, 226)B, 227)D.

228. કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલ લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?
A) સાયમન કમિશન વિરોધી લડત B) અસહકાર
C) બંગભંગ D) હોમરૂલ

229. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ?
A) મૌર્ય B) કુશાન C) ઈન્ડો-ગ્રીક D) ગુપ્ત

GPSC Class - 2 - 16/04/2017

230. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર ક્યું છે?
A) બૃહદેશ્વર B) કૈલાસનાથ C) મહાબલિપુરમ D) કોણાર્ક

231. 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા?
A) જયદેવ B) રવીન્દ્રનાથ ટાગોર
C) બંકીમચંદ્ર ચટોપાધ્યાય D) મોહમદ ઈકબાલ

232. હિંદ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલ ના લેખક કોણ છે?
A) જવાહરલાલ નહેરૂ B) બાલ ગંગાધર તિલક
C) મહાત્માં ગાંધી D) ગોપાલકૃષ્ણ ગોખલે

233. 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.
A) નાના સાહેબ B) કુવર સિંઘ
C) તાત્ય ટોપે D) ખાન બહાદુર ખાન

234. ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ (Privy Purse)" કોની સાથે સંકળાયેલ હતા?
A) જમીનદાર B) ભૂતપૂર્વ રાજાઓ
C) ઉદ્યોગપતિઓ D) સ્વાતંત્ર્ય સૈનિકો

235. ભારતમાં પહેલુ નિર્મીત " ભારત માતા મંદિર (Bharat Mata Mandir)" કયા સ્થળે આવેલ છે?
A) અમદાવાદ B) સુરત C) પૂણે D) વારાણસી

236. 'An introduction of the dream Land' ના લેખક કોણ છે?
A) ભગતસિંહ B) બાલ ગંગાધર તિલક
C) વિનાયક દામોદર સાવરકર D) સુભાષચંદ્ર બોઝ

237. 'ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ'નાં પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા?
A) સરોજીની નાયડુ B) વિજયાલક્ષ્મી પંડીત
C) એની બેસેન્ટ D) કદમ્બની ગાંગુલી

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

238. ક્યા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ?
A) ઋગવેદ B) સામવેદ C) યજુર્વેદ D) અથર્વવેદ

239. બૌદ્ધ સાહિત્યની ભાષા ....
A) અર્ધમાગધી છે. B) સંસ્કૃત છે.
C) પ્રાકૃત છે. D) પાલી છે.

240. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?
A) આર્યભટ્ટ B) ભાસ્કરાચાર્ય C) બ્રહ્મગુપ્ત D) ચરક

241. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.
A) દાદાભાઈ નવરોજી B) એ.ઓ.હ્યુમ
C) બાળગંગાધર તિલક D) ગોપાળકૃષ્ણ ગોખલે

242. ક્યા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ?
A) ઈ.સ.1910 B) ઈ.સ.1908 C) ઈ.સ.1911 D) ઈ.સ.1915

243. "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ?
A) અસહકાર B) દાંડીકૂચ C) ચંપારણ D) હિંદ છોડો

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

244. સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિન્દ ફોઝ'માં સામેલ કરી શકાયેલ હતા ?
A) ચીન B) જર્મની C) ઈટલી D) જાપાન

245. સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચુ નથી ?
1) બહાદુરશાહ ઝફર - દિલ્હી
2) નાનાસાહેબ - કાનપુર
3) કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
4) વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
A) 1 B) 2 C) 3 D) 4

246. પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ?
A) 1857 B) 1858 C) 1900 D) 1909

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

247. ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો?
A) પાલી B) હિંદી
C) અર્ધમાગધી D) ઉપર પૈકી કોઈ નહીં

248. 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું.
A) અમદાવાદ B) સુરત C) હરીપુરા D) રાજકોટ

249. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં ગામે થયો હતો?
A) ટંકારા B) મથુરા C) કાશી D) ભાવનગર

250. Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો?
A) બ્રિટીશ સંસદ B) લોકસભા
C) લોકસભા અને રાજયસભા D) રાજયસભા

251. મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો?
A) બખ્તિયાર ખલજી B) મલેક કાફુર
C) કુતુબુદ્દીન ઐબક D) ગ્યાસુદીન ખલજી

228)A, 229)C, 230)A, 231)D, 232)C, 233)C, 234)B, 235)D, 236)A, 237)C, 238)C, 239)D, 240)A, 241)B, 242)C, 243)D, 244)D, 245)C, 246)A, 247)A, 248)C, 249)A, 250)A, 251)C.

252. મોર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે?
A)ચંદ્રગુપ્ત B)બિંદુસાર C)બિંબિસાર D)અશોક

253. ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિધ્ધિ કઈ?
A)હૂણો ઉપરનો વિજય B)ચાલુકય વિજય
C)શક વિજય D)યવન વિજય

254. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે?
A)વલંદાઓ B)ફીરંગીઓ C)પારસી D)ફ્રેન્સ

255. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા?
A)તક્ષશીલા B)નાલંદા C)વલભી D)વિક્રમશીલા

256. દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા?
A)લોર્ડ ઈરવિન B)લોર્ડ રીડીંગ
C)લોર્ડ વીલીંગડન D)લોર્ડ હારડીંગ

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

257. સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું?
A)કન્નડ B)મલયાલમ C)તમિલ D)તેલુગુ

258. જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે?
A)ત્રિપિટક B)જાતક C)અવેસ્તા D)આગમ

259. નીચે જણાવેલ સંતોને તેમની ફિલસૂફી સાથે યોગ્ય રીતે જોડો.

સંત	ફિલસૂફી
a) રામાનુજ	1) અદ્વૈત્ય ફિલસૂફી
b) ચૈતન્ય	2) નિર્ગુણ ભક્તિ
c) શંકરા	3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
d) કબીર	4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

A)a - 3, b - 2, c - 1, d - 4 B)a - 1, b - 4, c - 3, d - 2
C)a - 3, b - 4, c - 1, d - 2 D)a - 2, b - 1, c - 4, d - 3

260. હોમરૂલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો?
A)આર્યલેન્ડ B)સ્કોટલેન્ડ C)યુ.એસ.એ D)કેનેડા

261. "ભારતીય ક્રાન્તિની માતા" તરીકે કોણ ઓળખાય છે?
A)લક્ષ્મીબાઈ B)બેગમ હઝરત મહાલ
C)દુર્ગા ભાભી D)મેડમ ભીખાજી રુસ્તમ કામા

262. નીચેનામાંથી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું?
A)ઈન્ડીયન ઓપીનીયન B) યંગ ઈન્ડિયા
C)વોઈસ ઓફ ઈન્ડિયા D)હરિજન

263. બ્રિટીશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી?
A)વેવલ B)માઉન્ટબેટન C)એટલી D)સાયમન

264. શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે?
A)બાળલગ્ન B)સ્ત્રી કેળવણી
C)સતીપ્રથા નાબુદી D)વિધવા પુનઃલગ્ન

265. કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા?
A)બિંદુસાર B)બિંબીસાર C)ચંન્દ્રગુપ્ત મૌર્ય D) અશોક

266. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?
A)એની બેસન્ટ B)સીસ્ટર નીવેદીતા
C)ડી.કે.કર્વે D)રવિન્દ્રનાથ ટાગોર

267. અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં?
A)ચંદ બારોટ B)હરિષેણ C)કાલિદાસ D)રાજશેખર

GPSC Class - 2 - 18/03/2017

268. (ઈન્ડીયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમ્યાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજુ કરેલ હતી?
A)શ્રી ભુલાભાઈ દેસાઈ B)શ્રી આસફ અલી
C)શ્રી સુભાષચંદ્ર બોઝ D)શ્રી સી.રાજગોપાલાચારી

269. નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.
A)વોરન હેસ્ટીંગ B)વેલેસ્લી
C)કોર્નવેલીસ D)વિલીયમ બેન્ટીક

270. પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાઓ પૈકી કયું જોડકુ સાચુ નથી?
1) મોહજો- દડો - ઈન્ડસ સિંધુ
2) હરપ્પા - રાવી
3) લોથલ - ભોગાવો
4) રોજડી - નર્મદા
A)1 B)2 C)3 D)4

271. કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.

1) મેઘદુત	A) વિષ્ણુ શર્મા
2) ગીત ગોવિંદ	B) બાણભટ્ટ
3) પંચતંત્ર	C) જયદેવ
4) હર્ષ ચરિત્ર	D) કવિ કાલિદાસ

A)1-B, 2-C, 3-D, 4-A B) 1-A, 2-B, 3-C, 4-D
C)1-D, 2-C, 3-A, 4-B D) 1-C, 2-A, 3-B, 4-D

272. રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.
1) સર્વન્ટ ઓફ ઈન્ડીયા - ગોપાલ કૃષ્ણ ગોખલે
2) ખુદાઈ ખીદમતગાર - અબ્દુલ ગફાર ખાન
3) ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ
4) સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન
A)1 B)2 C)3 D)4

252)D, 253)C, 254)B, 255)B, 256)A, 257)C, 258)D, 259)C, 260)A, 261)D, 262)C, 263)C, 264)A, 265)C, 266)C, 267)B, 268)A, 269)C, 270)D, 271)C, 272)D.

273. સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.

1) બ્રહ્મ સમાજ — A) સ્વામી વિવેકાનંદ
2) પ્રાર્થના સમાજ — B) સ્વામી દયાનંદ
3) આર્ય સમાજ — C) આત્મારામ પાંડુરંગ
4) રામક્રિષ્ણ મીશન — D) રાજા રામ મોહન રાય

A) 1-C, 2-B, 3-A, 4-D B) 1-D, 2-C, 3-B, 4-A
C) 1-B, 2-A, 3-D, 4-C D) 1-A, 2-D, 3-C, 4-B

274. સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.

1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ
2) ગોરા - રવિન્દ્રનાથ ટાગોર
3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટીળક
4) ડીસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહર લાલ નેહરૂ

A) 1, 2 અને 3 B) 1, 2 અને 4
C) 2, 3 અને 4 D) 1, 2, 3 અને 4

275. મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps for old" કે જે 1893-94 માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

A) બિપીન ચંદ્ર પાલ B) અરવિંદો ઘોષ
C) અશ્વીની કુમાર D) બાલ ગંગાધર ટિલક

GPSC Class - 1 - 28/01/2017

276. ઈ.સ.1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતુ?

A) 1632 B) 1640 C) 1645 D) 1653

277. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી?

A) 1855 B) 1857 C) 1860 D) 1875

278. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

A) વેલેસ્લી B) વોરન હેસ્ટિંગ્સ C) ડેલહાઉસી D) કેનિંગ

279. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

A) વેલેસ્લી B) ડેલહાઉસી
C) વોરન હેસ્ટિંગ્સ D) વિલિયમ બેન્ટિક

280. હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?

A) પંજાબ, રાજસ્થાન અને ગુજરાત
B) પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ
C) હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી
D) ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ

નાયબ ચિટનીશ - 02/06/2015

281. પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ .... છે.

A) પંચસિદ્ધાંતિકા B) અષ્ટાંગહૃદય
C) બ્રહ્મસિદ્ધાંત D) લીલાવતી ગણિત

282. વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય?

A) આધુનિક ભારત B) રાષ્ટ્રીય ભારત
C) અભિનવ ભારત D) આપણું ભારત

283. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા?

A) 3 B) 5 C) 7 D) 4

284. બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત.........તરીકે ઓળખાય છે.

A) જાહેર દરખાસ્ત B) આધુનિક દરખાસ્ત
C) ઓગસ્ટ દરખાસ્ત D) કોમી દરખાસ્ત

નાયબ ચિટનીશ - 05/02/2017

285. 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ?

A) કારતક B) વૈશાખ C) માગશર D) ચૈત્ર

GPSC Class - 2 - 16/04/2017

286. દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ?

A) ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)
B) નુરેજહાન
C) જહાન આરા D) સંયુક્તા

287. મહમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા?

A) અલબરૂની B) ઈબ્નબતૂતા C) ફિરદૌસ D) ફૈઝી

288. નીચેનામાંથી કયુ જોડકું યોગ્ય નથી?

લેખક	કૃતિ
A) કાલિદાસ	- રઘુવંશ
B) વિશાખા દત્ત	- મુદ્રારાક્ષસ
C) વિષ્ણુ શર્મા	- પંચતંત્ર
D) ગાંધીજી	- ધી ડિસ્કવરી ઓફ ઈન્ડિયા

289. દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા?

A) 4 B) 3 C) 2 D) 1

290. "ગદર પાર્ટી"ની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી?

A) જાપાન B) જર્મન C) અમેરિકા D) અફઘાનિસ્તાન

291. સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગર્વનર-જનરલ કોણ હતા?

A) ડો. રાજેન્દ્ર પ્રસાદ B) ગોવિંદ વલ્લભ પંત
C) લોર્ડ માઉન્ટ બેટન D) સી. રાજગોપાલચારી

292. ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે?

1) સરદાર વલ્લભભાઈ પટેલ 2) શ્રી વી.પી.મેનન
3) શ્રી જવાહરલાલ નેહરૂ 4) લાલા લજપતરાય

A) 1 અને 2 B) 2 અને 3 C) 3 અને 4 D) 4 અને 1

273)B, 274)D, 275)B, 276)D, 277)B, 278)B, 279)B, 280)A, 281)D, 282)C, 283)A, 284)C, 285)D, 286)A, 287)A, 288)D, 289)B, 290)C, 291)D, 292)A.

293. પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી ક્યા તત્વથી અજાણ હતી?
A)ટીન B) એલ્યુમિનીયમ
C)પારો D) ગંધક

GPSC Class - 2 - 02/04/2017

294. નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી ક્યા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ?
A)ચંપા B)સાકેત C) પાટલીપુત્ર D)કૌસંબી

295. દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?
A)મુહમ્મદ-બીન તુઘલક B) અલાઉદ્દીન ખીલજી
C)ગ્યાસુદ્દીન તુઘલક D) ફીરૂઝ તુઘલક

296. અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?
A)કુતુબ મિનાર B) કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ
C)ઈલ્તુમીશનો ગુંબજ D) ઉપર પૈકી એકપણ નહીં

297. મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે ક્યા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ?
A)બલ્બન B) અલાદ્દીન ખીલજી
C)મુહમ્મદ બિન તુઘલક D) ફિરૂઝ તઘલક

298. ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?
A)જ્યોતિષશાસ્ત્ર B) તબીબી શાખાની યુનાની પદ્ધતિ
C)બાગાયત વિદ્યા D) ગણિત શાસ્ત્ર

299. મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર ક્યો વિકલ્પ સાચો છે ?
A)સુબાહ, માક્તા, પરગણા B) શીક, મુક્તા, પરગણા
C)સુબાહ, સરકાર, પરગણા D)સુબાહ, આમીલ, સરકાર

300. ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શીયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?
A)રામાયણનો B) મહાભારતનો
C)અથર્વવેદનો D)રાજતરંગિણીનો

301. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી?
A)મુઘલ B)મરાઠા C) અંગ્રેજો D)પેશવા

302. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ?
A)કાલિકટ B)ગોવા C) કોચી D)દિવ

303. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?
A)એપ્રિલ, 1935 B) માર્ચ 1936
C)જુન 1936 D) ફેબ્રુઆરી, 1937

304. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ- 1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ?
A)રાણી વિક્ટોરિયા B)બ્રિટીશ સાંસદ
C)બ્રિટિશ સરકાર D)ઉપર પૈકી એકપણ નહીં

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

305. નીચેના વિધાન પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચા છે?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું
A)ફક્ત (1) સાચું છે B) ફક્ત (1) અને (2) સાચાં છે
C) ફક્ત (1) અને (3) સાચાં છે D)તમામ વિધાનો સાચાં છે

306. નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.
1) પાણિનીનું અષ્ટાધ્યાયી
2) પતંજલીનું મહાભાષ્ય
3) વામન અને જયાદીત્યનું કશિકા
4) કાત્યાયનનું વર્તિકા
A) 1, 2, 3, 4 B) 1, 3, 4, 2 C) 1, 3, 2, 4 D) 1, 4, 2, 3

307. છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન ક્યા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?
A)ગુરૂ રામદાસ B)બાલાજી વિશ્વનાથ
C)તાનાજી D)રાઘોબા

308. મેગેસ્થિનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો?
A)4 B)5 C)6 D)7

309. નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ?
A)બેક્ટેરિયન ગ્રીક B) કુશાન
C)મૌર્ય D)ગુપ્ત

310. નીચેનાં પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?
A)રાજારાજા ચોલા-I B)રાજેન્દ્ર ચોલા-I
C)રાજાધીરાજા ચોલા D)અધિરાજેન્દ્ર ચોલા

311. શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ?
A)ધી ઈન્ડિયા હાઉસ B)ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ
C)ધી ઈન્ડિયન અનરેસ્ટ D)ધી ઈન્ડિયન વોઈસ

312. "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં?
A)મુઘલ અર્થતંત્ર B) મરાઠા અર્થતંત્ર
C) બ્રિટિશ અર્થવ્યવસ્થા D)ચાલુક્ય અર્થતંત્ર

313. નીચેના પૈકી ક્યા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવાકે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે?
A) યજુર્વેદ B) અથર્વવેદ
C) શતપથ બ્રાહ્મણ D) મંડુક્ય ઉપનિષદ

293)B, 294)C, 295)A, 296)B, 297)C, 298)B, 299)C, 300)B, 301)D, 302)C, 303)D, 304)C, 305)A, 306)D, 307)C, 308)D, 309)A, 310)B, 311)B, 312)B, 313)C.

GPSC Class - 2 - 12/02/2017

314. નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે?
A)આમરી B)કોટદિજી C)મહેરગઢ D)કાલીબંગન

315. અંગ્રેજી શાસન દરમ્યાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઈસરોયના સમયમાં કરવામાં આવી?
A)લોર્ડ મેયો B)લોર્ડ લિટન C)લોર્ડ કેનિંગ D)લોર્ડ રિપન

316. નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી?
A)બનારસ B)હાવડા C)ઢાકા D)લાહોર

317. બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો?
A)પહેલી B)પહેલી અને બીજી
C)પહેલી અને ત્રીજી D)બીજી અને ત્રીજી

GPSC Class - 1 - 09/04/2017

318. શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમ્યાન નવું નામ ગ્રાંડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?
A)એનએચ-1 B)એનએચ-2
C)એનએચ-3 D)એનએચ-1 તથા એનએચ-2

319. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?
A)પુલકેશી બીજો B)વિક્રમાદિત્ય બીજો
C)યજનવર્મન D)પુલકેશી પહેલો

320. અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?
A)બરાની B)ઈસામી
C)ઈબ્ન-બતૂતા D)અમીર ખુશરો

321. કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ?
A)દસમી સદી B)અગિયારમી સદી
C)બારમી સદી D)તેરમી સદી

322. "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફલેગ ડે ની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?
A)કાનપુર B)નાગપુર C)નૈનિતાલ D)ભોપાળ

323. અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ?
A)લખનૌ B)સુરત C)દિલ્હી D)અલીગઢ

324. ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી?
A)એક્ટ - VI (છ) B)એક્ટ - V (પાંચ)
C)એક્ટ - III (ત્રણ) D)એક્ટ - VIII (આઠ)

325. ઈ.સ.1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?
A)સુરેન્દ્રનાથ બેનરજી B)આનંદમોહન બોઝ
C)નાબાગોપાલ મિત્રા D)રાજનારાયણ બાસુ

GPSC Class - 2 - 04/03/2017

326. એક જ પથ્થરમાંથી બનાવાયેલ (Monolith type) કૈલાસમંદિર કયા આવેલું છે ?
A)અજંતાની ગુફાઓ B)ઈલોરાની ગુફાઓ
C)એલિફન્ટાની ગુફાઓ D)જોગીમારા ગુફાઓ

327. મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ?
A)સોમનાથ B)સાંચીનો સ્તૂપ
C)મહાબલિપુરમ્ D)પેગોડા

328. બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?
A)ચંદ્રગુપ્ત મૌર્ય B)બિંદુસાર
C)સંપ્રતિ D)બૃહદરથ

329. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ?
A)ફ્રાંસિસ્કો-દ અલ્મોડા B)અલ્ફાંસો-દ-અલ્બુકર્ક
C)વાસ્કોડીગામા D)કોરનેલિસ-ડ-હસ્તમાન

330. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી?
A)ઈજારેદારી
B)સ્થાયી બંદોબસ્ત (Permanent settlement)
C)મહાલવારી D)રૈયતવારી

331. "ઈન્ડિયન રીપબ્લિકન આર્મી"નું ગઠન કોણે કર્યું હતું ?
A)સુભાષચંદ્ર બોઝ B)ગોપાલકૃષ્ણ ગોખલે
C)સૂર્યસેન D)ચંદ્રશેખર આઝાદ

332. નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ?
A)વીર સાવરકર B)વાસુદેવ બળવંત ફડકે
C)ખુદીરામ બોઝ D)ચંદ્રશેખર આઝાદ

333. કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ?
A)મૌર્યકાળ B)પાંડ્યકાળ C)ગુપ્તકાળ D)શક-ક્ષત્રપકાળ

334. મુસ્લીમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ?
A)15 ઓગસ્ટ, 1946 B)13 ઓગસ્ટ, 1946
C)16 ઓગસ્ટ, 1946 D)16 ઓગસ્ટ, 1945

314)C, 315)B, 316)D, 317)C, 318)D, 319)A, 320)D, 321)C, 322)B, 323)C, 324)B, 325)A, 326)A, 327)B, 328)C, 329)A, 330)D, 331)C, 332)A, 333)D, 334)C.

335. ક્યા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ?

A) બ્રિટીશના B) ડચના C) પોર્ટુગીઝના D) ફ્રાંચના

336. આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

A) જવાહરલાલ નહેરુ B) સુભાષચંદ્ર બોઝ
C) મોતીલાલ નહેરુ D) માનવેન્દ્રનાથ રોય

337. બ્રિટીશ સરકારે સૌ પ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો?

A) 5% B) 8% C) 1% D) 10%

GPSC Class - 2 - 18/03/2017

338. ક્યા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

A) બિંબિસાર B) બિંદુસાર
C) ચંદ્રગુપ્ત મૌર્ય D) અશોક

339. ગુપ્તવંશનું રાજકીય ચિન્હ શું હતું ?

A) સિંહ B) મોર C) ગરુડ D) સાપ

340. તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

A) મેંગ્લોરની સંધિ B) શ્રી રંગપટ્ટનમની સંધિ
C) મદ્રાસની સંધિ D) પુરંદરની સંધિ

341. રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ?

A) બલ્બન B) ઈલ્તુતમિશ
C) મામલુક D) અલાઉદ્દિન ખીલજી

342. ભારતના પ્રથમ ગર્વનર જનરલ કોણ હતા ?

A) લોર્ડ કોર્નવોલિસ B) લોર્ડ ઓકલેંડ
C) લોર્ડ ડેલહાઉસી D) લોર્ડ વિલિયમ બેન્ટિક

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર કલાસ - 2 (25/2/2017)

343. પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?

A) વિક્રમશીલા વિશ્વવિદ્યાલય B) નાલંદા વિશ્વ વિદ્યાલય
C) તક્ષશિલા વિશ્વવિદ્યાલય D) વલ્લભી

344. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા?

A) રાજકુમારી અમૃત કૌર B) શ્રીમતી નલ્લીસેન ગુપ્તા
C) સરોજીની નાયડુ D) શ્રીમતી એની બેસન્ટ

345. હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો?

A) કુમારગુપ્ત પ્રથમ B) સ્કંદગુપ્ત
C) બુદ્ધગુપ્ત D) પુરુગુપ્ત

346. કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

A) વિક્રમાદિત્ય પાંચમો B) તૈલપ પ્રથમ
C) સોમેશ્વર બીજો D) વિક્રમાદિત્ય છઠ્ઠો

347. જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ?

A) અલાઉદીન ખીલજી B) ઈલ્તુતમિશ
C) બલ્બન D) ગ્યાસુદ્દીન તુગલક

348. નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું?

A) બાજીરાવ પહેલો B) બાજીરાવ બીજો
C) નાના ફડનવીસ D) બાલાજી બાજીરાવ

349. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

A) અબુલ કલામ આઝાદ B) વ્યોમેશચંદ્ર બેનરજી
C) દાદાભાઈ નવરોજી D) સુરેન્દ્રનાથ બેનર્જી

350. 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

A) મહાત્મા ગાંધીજી B) મહાત્મા જ્યોતિબા ફુલે
C) ડૉ. બાબાસાહેબ આંબેડકર D) પંડિત જવાહરલાલ નેહરુ

GPSC Class - 2 - 5/3/2017

351. "તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

A) લાલા લજપતરાય B) સુભાષચંદ્ર બોઝ
C) સુરેન્દ્રનાથ બેનરજી D) દાદાભાઈ નવરોજી

352. 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.
2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.
3. લંડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.
4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતુ. આ બાબતો કોને લાગું પડે છે ?

A) મેડમ કામા B) અશફાક ઉલ્લાબાં
C) શ્યામજી કૃષ્ણવર્મા D) ખુદીરામ બોઝ

GPSC Class - 2 - 11/12/2016

353. દિલ્હીનો કુતુબમિનાર ક્યા રાજવીએ બંધાવ્યો હતો ?

A) અકબર B) શાહજહાં C) કુતુદીન ઐબક D) જહાંગીર

354. ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે ?

A) ઉજ્જૈન B) કલિંગ C) અરીકા મેડુ D) અયોધ્યા

335)C, 336)B, 337)C, 338)A, 339)C, 340)B, 341)B, 342)D, 343)B, 344)D, 345)A, 346)D, 347)C, 348)D, 349)A, 350)C, 351)B, 352)C, 353)C, 354)C.

355. દિલ્હીના ક્યા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ?
A)અલાઉદ્દીન B) મહમદ ગઝનવી
C) બલ્બન D)બાબર

356. પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ?
A)1750 B)1780 C)1771 D)1761

357. ક્યા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ?
A)રિપન B) વિલિયમ બેન્ટિક
C) ડેલહાઉસી D) કોર્નવોલિસ

358. 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?
A) ગોપાલકૃષ્ણ ગોખલે B) મહાત્મા ગાંધી
C) બાળ ગંગાધર ટિળક D) લાલા લજપતરાય

359. સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?
A)અસહકારનું આંદોલન B) સવિનય કાનૂન ભંગ આંદોલન
C) હિન્દ છોડો આંદોલન D) ખિલાફત આંદોલન

360. જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?
A) જનરલ ડાયર B) બેન્ટિક C) કેનિંગ
D)ડેલ હાઉસી

361. 'યાદગાર અ તકસીમ'એ શેની યાદમાં સમર્પિત છે ?
A) 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
B) મોગલ બાંધકામની ભવ્યતા
C) ભારતના ભાગલા
D) ઈન્ડિયન નેશનલ આર્મી

GPSC Class - 2 - 05/02/2017

362. સંગીતનો વાંજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે?
A)અમીર ખુસરો B) હમીદરાજા C) બહેરોજ D) મુહમ્મદયંગી

363. બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ ક્યા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ?
A)સુત્રપિટ્ટીકા B) અભિધમ્મ-પિટ્ટીકા
C) વિનિય-પિટ્ટીકા D) જાતકથા

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

364. ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું?
A)ચંદેલ રાજવીઓ B) ચાલુક્ય વંશના રાજવીઓ
C) રાજરાજા પ્રથમ D) નૃસિંહજર્મન પ્રથમ

365. તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ .... શૈલીનો ઉત્તમ નમૂનો છે.
A) મથુરા શૈલી B) પૂર્વ મૌર્યકાલીન શૈલી
C) દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી D) ગાંધાર શૈલી

366. બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે?
A) વિનય પિટક B) સુક્ત પિટક
C) અભિધમ્મ પિટક D) મિલિન્દ પહનો

367. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
A) મુદ્રારાક્ષસ-વિશાખદત્ત B) કથાસરિત્સાગર-સોમદેવ
C) હુમાયુનામા-હુમાયુ D) કુમારસંભવ-કાલિદાસ

368. સમ્રાટ વિક્રમાદિત્યનો ....તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુક્રમનો ઉત્તમ નમુનો ગણાય છે.
A) સારનાથનો સ્તંભ B) સાંચીનો સ્તંભ
C) નંદનગઢનો સ્તંભ D) લોહસ્તંભ

369. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?
A) લોર્ડ વેલિંગ્ટન B) લોર્ડ ચેમ્સફર્ડ
C) લોર્ડ લિટન D) સર જાર્જ સ્ટેનલે

370. ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો?
A) ઈ.સ. 1981 B) ઈ.સ. 1928 C) ઈ.સ. 1917 D) ઈ.સ. 1920

371. ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું?
A) નવેમ્બર, 1932 B) ડીસેમ્બર, 1932
C) નવેમ્બર, 1931 D) સપ્ટેમ્બર, 1931

372. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?
A) લોર્ડ એલિગ્ન B) લોર્ડ મિન્ટો દ્વિતીય
C) લોર્ડ હાર્ડિંગ D) લોર્ડ ચેમ્સફર્ડ

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

373. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિંદ' અપનાવવામાં આવ્યું હતું ?
A) ખુદાઈ ખીદમતગર B) ગદર પાર્ટી
C) ઈન્ડિયન નેશનલ આર્મી D) સ્વરાજ પાર્ટી

374. કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?
A) સિંધુની ખીણ B) ગંગાની ખીણ
C) બ્રહ્મપુત્રની ખીણ D) નર્મદાની ખીણ

375. મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?
A) ઋગ્વેદ B) અથર્વવેદ
C) મૂંડક ઉપનિષદ D) ચંદોગ્યા ઉપનિષદ

376. પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?
A) વ્યાકરણશાસ્ત્રી B) ખગોળશાસ્ત્રી
C) કવિ D) ગણિતશાસ્ત્રી

355)A, 356)D, 357)C, 358)C, 359)A, 360)A, 361)C,362)A, 363)C, 364)A, 365)D, 366)B, 367)C, 368)D, 369)A, 370)C, 371)A, 372)C, 373)C, 374)A, 375)C, 376)A.

377. નીચેના ક્યા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ?
A) નાનક B) રામાનંદ C) કબીર D) શંકરાચાર્ય

378. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?
A) ડબ્લ્યુ સી.બેનરજી B) એ.ઓ.હ્યુમ
C) મહાત્મા ગાંધી D) એની બેસન્ટ

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

379. મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ ક્યા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું?
A)સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
B)લોકો દ્વારા પુરતો સહકાર ન મળવાથી
C)ચૌરીચૌરાની ઘટનાથી
D)સરકારશ્રી સાથે સમાધાન થવાથી

380. મોગલ બાદશાહ અને પ્રસંગ/સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) બાબર A)તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો
2) હુમાયુ B)મોગલ સામ્રાજ્યના સ્થાપક
3) અકબર C)શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા.
4) ઔરંગઝેબ D)બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય
A) 1-D, 2-B, 3-C, 4-A B) 1-A, 2-D, 3-B, 4-C
C) 1-B, 2-C, 3-A, 4-D D) 1-C, 2-A, 3-D, 4-B

381. ગવર્નર/વાઈસરોય અને તેઓના કાર્યને જોડો.
1) રોબર્ટ ક્લાઈવ A)બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના
2) વોરન હેસ્ટીંગ B)મહેસુલી અધિકારીઓની નિમણુંક
3) વિલીયમ બેન્ટીંગ C)પ્રથમ ગવર્નર જનરલ
4) ચાર્લ્સ મેટકાલફે D)પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા
A) 1-A, 2-B, 3-C, 4-D B) 1-B, 2-C, 3-D, 4-A
C) 1-C, 2-D, 3-A, 4-B D) 1-D, 2-A, 3-B, 4-C

382. સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી A)નાગપુર
2) સ્વદેશી મિત્ર મંડળ B) મુંબઈ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ C) બંગાળ
4) ઝંડા સત્યાગ્રહ D)અમદાવાદ
A) 1-C, 2-B, 3-A, 4-D B) 1-D, 2-C, 3-B, 4-A
C) 1-B, 2-A, 3-D, 4-C D) 1-A, 2-D, 3-C, 4-B

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

383. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?
A)તેલુગુ - સંસ્કૃત B) સંસ્કૃત - તામિલ
C)તામિલ - મલયાલમ D) મલયાલમ - તેલુગુ

384. ક્યા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?
A)ભગતસિંહે B) શ્યામજીકૃષ્ણ વર્માએ
C)વિનાયક સાવરકરે D)ચંદ્રશેખર આઝાદે

385. ઈ.સ.1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ?
A)સતલજ B)કાવેરી C)હુગલી D)નર્મદા

386. ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?
A)ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી B) કોલકાતા, દિલ્હી, મુંબઈ
C) દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ D)મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા

387. ભારતને 'જયહિન્દ'નો મંત્ર કોણે આપ્યો હતો ?
A) મહાત્મા ગાંધીજીએ B) સુભાષચંદ્ર બોઝે
C) મોરારજી દેસાઈએ D) મહાદેવભાઈ દેસાઈએ

388. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ?
A) 25-07-1757 B) 23-08-1757
C) 29-09-1757 D) 23-06-1757

389. ઈ.સ.1829માં ક્યા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?
A) વિલિયમ બેન્ટિક B) વિલિયમ જ્યોર્જ
C) વિલિયમ ક્લાઈવ D) વિલિયમ ટલે

390. કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા?
A) વરાહમિહિરને B) આર્યભટ્ટને
C) બ્રહ્મગુપ્તને D) ભાસ્કરાચાર્યને

391. ક્યા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ?
A) ગાંધાર B) કામરૂપ (આસામ)
C) બુંદેલખંડ D) કાશ્મીર

392. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના ક્યા શહેરમાં થયો હતો ?
A) ભુવનેશ્વર B) કટક C) કોલકાતા D) પુરી

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

393. 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?
A) સ્વામી વિવેકાનંદ B) સ્વામી દયાનંદ સરસ્વતી
C) ગાંધીજી D) સ્વામી રામતીર્થ

394. સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?
A) લોર્ડ માઉન્ટબેટન B) એસ.રાધાકૃષ્ણન
C) સી.વી.રામન D) સી.રાજગોપાલાચારી

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

395. એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ?
A) બિપીનચંદ્ર પાલ B) બાળગંગાધર ટીળક
C) લાલા લજપત રાય D) એકેય નહીં

377)D, 378)B, 379)C, 380)C, 381)A, 382)B, 383)A, 384)C, 385)C, 386)D, 387)B, 388)D, 389)A, 390)B, 391)C, 392)B, 393)B, 394)D, 395)B.

396. આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?
A) મૂળશંકર દયારામ B) લાભશંકર સાધુરામ
C) રણછોડરાય દયારામ D) એકેય નહીં

397. અકબરના અવસાન બાદ ઈ.સ.1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ?
A) શાહજહાં B) ઔરંગઝેબ
C) સલીમ (જહાંગીર) D) એકેય નહીં

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

398. આર્યસમાજની સ્થાપના કોણે કરી ?
A) રાજારામ મોહનરાય B) દયાનંદ સરસ્વતી
C) મહાત્મા ગાંધી D) સ્વામી વિવેકાનંદ

399. સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?
A) વિજયાલક્ષ્મી પંડિત B) વલ્લભભાઈ પટેલ
C) વિનોબા ભાવે D) વિક્રમ સારાભાઈ

400. જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર)કોણ હતા ?
A) મહાવીર સ્વામી B) શાંતિનાથ
C) નેમિનાથ D) આદિનાથ (ઋષભદેવ)

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

401. સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઈતિહાસમાં તે અરે......તરીકે પ્રખ્યાત થયા છે.
A) સંગીત સમ્રાટ B) સંગીત રત્નાકર
C) તુતી-એ-હિંદ D) ઉપર પૈકી એક પણ નહીં

402. પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જિદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી?
A) હુમાયુ B) બાબર C) અકબર D) શાહજહાં

403. મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક.......સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.
A) તેલુગુ B) સંસ્કૃત C) તમિલ D) કન્નડ

404. પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો?
A) પ્રજાનો રક્ષક
B) યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
C) ગામનો રક્ષક D) ઉપર પૈકી એક પણ નહી

405. કથિત 'કાળી કોઠરીની ઘટના' (Black Hole Incident) કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે?
A) પ્લાસીનું યુદ્ધ B) બકસરનું યુદ્ધ
C) પ્રથમ કર્ણાટક વિગ્રહ D) તૃતિય કર્ણાટક વિગ્રહ

406. ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો?
A) 16 ઓક્ટોબર B) 25 સપ્ટેમ્બર
C) 16 સપ્ટેમ્બર D) 25 ઓક્ટોબર

407. કયા વર્ષમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક અપાયો હતો?
A) ઈ.સ.1669 B) ઈ.સ.1677 C) ઈ.સ.1683 D) ઈ.સ.1700

408. નીચે પૈકી કયા ગર્વનર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો?
A) લોર્ડ મેટ્કાફ B) લોર્ડ એમહર્સ્ટ
C) લોર્ડ હેસ્ટીંગ્સ D) લોર્ડ કેનીંગ

409. "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી?
A) દયાનંદ સરસ્વતી B) રાજા રામમોહનરાય
C) જ્યોતિબા ફૂલે D) અમૃતલાલ ઠક્કર

મુખ્ય સેવિકા - 8/1/2017

410. નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો?
A) બાબર B) શાહજહાં C) હુમાયું D) અકબર

વિસ્તરણ અધિકારી - 7/1/2017

411. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ?
A) પોર્ટુગીઝ B) ફ્રેન્ચ C) અંગ્રેજ D) જર્મન

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

412. અખંડ ભારતની બે ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી?
A) સી.રાજગોપાલાચાર્ય B) સરદાર વલ્લભભાઈ પટેલ
C) ડૉ.ભીમરાવ આંબેડકર D) માઉન્ટ બેટન

413. ગાંધી-ઈરવીન સમજૂતી ક્યારે થઈ હતી?
A) માર્ચ -1930 B) માર્ચ- 1931
C) માર્ચ - 1932 D) માર્ચ - 1929

414. ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી?
A) દેવેન્દ્રનાથ ટાગોર B) કેશવચંદ્ર સેન
C) પંડિત ગુરુદત્ત D) રાજા રામમોહનરાય

415. 'બેંગોલ ગેઝેટ'નામનું સર્વપ્રથમ સંમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું?
A) જેમ્સ ઓગસ્ટસ હિકી B) મેક્સમૂલર
C) ફિનલોક ફાર્બસ D) સર એલેક્ઝાંડર

416. ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે?
A) દયાનંદ સરસ્વતી B) લાલા હંસરાજ
C) સ્વામી શ્રદ્ધાનંદ D) જ્યોતિબા ફુલે

417. 'રાસ્ત ગોફતાર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું?
A) ભિખાઈજી કામા B) કે.આર.કામા
C) દાદાભાઈ નવરોજી D) બહેરામજી મલબારી

396)A, 397)C, 398)B, 399)C, 400)D, 401)C, 402)B, 403)D, 404)B, 405)A, 406)A, 407)A, 408)B, 409)C, 410)D, 411)A, 412)D, 413)B, 414)D, 415)A, 416)D, 417)C.

418. અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.
A)ગોપાલકૃષ્ણ ગોખલે B)વિનાયક સાવરકર
C)મદનલાલ ધીંગરા D)બાલ ગંગાધર તિલક

419. રથમંદિરો ક્યા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ?
A)ગુપ્ત B)પલ્લવ C)કુશાણ D)સોલંકી

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

420. રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ?
A)આવક B)ધર્મ C)ખર્ચ D)દંડ

421. દાહોદ ખાતે મોગલ સામ્રાજયના કયા રાજાનો જન્મ થયો હતો?
A)કુતબુદ્દીન B)જહાંગીર C)અહમદશાહ D)ઔરંગઝેબ

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

422. ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.
A)રાજકુમારી અનંતાસીંધ B) ઈન્દિરા ગાંધી
C)રાજકુમારી અમૃતાકૌર D)કમલા નેહરુ

TET-II -2017

424. કાંગડી ગુરુકુલની સ્થાપના કોણે કરી હતી ? - **સ્વામી શ્રદ્ધાનંદ**

425. ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરનાર પુરાતત્વવિદ કોણ છે? - **એલેકઝાન્ડર કનિંગહામ**

426. આઠમીથી બારમી સદીના સમયગાળાને ક્યા કાળ તરીકે ઓળખવામાં આવે છે ? - **પૂર્વ મધ્યકાળ**

427. ભોજપત્રો અને તાડપત્રો પર કઈ લિપિમાં લખાણ વધુ જોવા મળે છે ? - **પાંડુ**

428. ક્યા સૂર્યમંદિરને રથનો ઘાટ આપી સાત ઘોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ આપવમાં આવ્યુ છે ? - **કોણાર્ક**

429. મોતીહારી ગામ ગાંધીજીએ શરૂ કરેલ કઈ લડતના સંબંધમાં સંકળાયેલ છે ? - **ચંપારણ સત્યાગ્રહ**

430. હર્ષચરિત અને કાદંબરી જેવી પ્રખ્યાત કૃતિઓની રચના કોણે કરેલ ? - **બાણભટ્ટ**

431. ભોજપત્રો બનાવવામાં ક્યા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો ? - **ભૂર્જ**

432. હર્ષવર્ધન રચિત નાટક ક્યું છે ? - **રત્નાવલી**

433. હિતોપદેશની રચના ક્યા વાર્તાસંગ્રહને આધારે કરવામાં આવી હતી ? - **પંચતંત્ર**

434. કઈ કૃતિ હર્ષવર્ધને લખી હતી ? - **પ્રિયદર્શિકા**

435. કુતુબમિનારના નિર્માણની શરૂઆત........એ કરેલી અને તેનો વિસ્તાર ....એ કર્યો હતો. - **કુતુબુદ્દીન ઐબક, ઈલ્તુતમિશ**

436. ક્યું રાજ્ય વેલેસ્લીની સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર બન્યું? - **હૈદરાબાદ**

437. મુઘલ શાસન સમયે ક્યા ફ્રેન્ચ મુસાફરો ભારતમાં આવેલા ? - **ટેવર્નિયર અને બર્નિયર**

438. વલ્લભાચાર્યએ પોતાની તીર્થયાત્રા દરમિયાન જ્યાં-જ્યાં શ્રીમદ ભાગવત કથા અને પારાયણ કર્યા તે સ્થળો .... તરીકે ઓળખાય છે. - **બેઠક**

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

439. 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન..............નું છે. - **ચાણક્ય**

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

440. તમાકુનો પાક, ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી ? - **પોર્ટુગીઝ**

441. દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમનાં અધૂરાં કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનારાં તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું ? - **માતા સુંદરી**

પોલીસ કોન્સ્ટેબલ - 2012

442. જોડકા અંગે ક્યો જવાબ સાચો છે? - **1885 : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, 1919 : જલિયાવાલા બાગ હત્યાકાંડ, 1942 : ભારત છોડો ચળવળ, 1869 : મહાત્મા ગાંધીનો જન્મ**

443. અશોક ક્યા વંશનો રાજા હતો ? - **મૌર્ય વંશ**

444. ક્યા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? - **ગુપ્ત-કાળ**

445. 'કરો યા મરો' સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે? - **ભારત છોડો ચળવળ**

446. 'રામાયણ'ના રચયિતા કોણ છે? - **વાલ્મિકી**

447. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહે જોદરો કયાં આવેલું છે? - **પાકિસ્તાન**

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

448. સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ક્યા ભરાઈ ? - **શિકાગો**

449. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ? - **સમર્થ રામદાસ**

450. ક્યા શાસ્ત્ર સાથે મહર્ષિ સુશ્રુતનું નામ સંકળાયેલું છે? - **તબીબી-વાઢકાપ**

451. સતી પ્રથાની નાબૂદી માટે ઝઝુમેલા વીરનું નામ શું છે? - **રાજા રામમોહનરાય**

પ્રોબેશન ઓફિસર - 2016

452. ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? - **લોર્ડ વોરન હેસ્ટિંગ્સ**

418)A, 419)B, 420)B, 421)D, 422)C.

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

453. બ્રિટીશ સરકારે ઈંગ્લેન્ડના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે રોલેટ એક્ટ ક્યારે ઘડ્યો હતો ? - **ઈ.સ.1919**
454. હાલનું અજમેર પ્રાચીન કાળમાં ક્યા નામે ઓળખાતું હતું ? - **અજયમેરુ**
455. ક્યા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિન્હ રહેતું ? - **પુલકેશી પહેલો**
456. 'મૈસુરના વાઘ' તરીકે કોણ જાણીતું હતું ? - **ટીપુ સુલતાન**
457. ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે ? - **1028**
458. કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા ક્યા નામે લખી હતી ? - **તુઝુકે જહાંગીરી**
459. ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ? - **સમુદ્રગુપ્ત**
460. ગાંધીજીને 'બાપુ'નું બિરુદ ક્યા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? - **ચંપારણ સત્યાગ્રહ**
461. 'કરેંગે યા મરેંગે'- આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? - **હિંદ છોડો ચળવળ**
462. ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? - **ઈ.સ.1858**
463. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? - **રોલેટ એક્ટ**
464. કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ? - **બીજી**
465. ભારતમાં અંગ્રેજી (પાશ્ચાત્ય)ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ? - **કોર્નવીલીસ**
466. ક્યો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે? - **પીટનો ધારો**
467. પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવવાનું ક્યા અધિવેશનમાં નક્કી થયું હતું ? - **લાહોર**
468. ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? - **વાસ્કો-દ-ગામા**
469. અજંતા-ઈલોરાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ? - **મહારાષ્ટ્ર**
470. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ? - **મેડમ ભિખાઈજી કામા**
471. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? - **23 જૂન, 1757**
472. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? - **ત્રિપિટક**
473. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? - **ઈ.સ.1857**
474. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ? - **સ્વામી વિવેકાનંદ**
475. નીચેના પૈકી ક્યો વેદ 'સંગીતની ગંગોત્રી' તરીકે જાણીતો છે ? - **સામવેદ**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

476. ક્યા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા? - **શ્યામજીકૃષ્ણ વર્મા**
477. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? - **મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે**

મહેસૂલી તલાટી - 2014

478. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? - **બાબર-ઈબ્રાહીમ લોદી**
479. ગુજરાતના ક્યા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી? - **શ્યામજી કૃષ્ણ વર્મા**
480. ક્યા યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ? - **ગુપ્તયુગ**

TET- II - ભાષા - 2014

481. સાચું જોડકું ગોઠવો - જયજવાન, જય કિસાન : લાલ બહાદુર શાસ્ત્રી, આરામ હરામ હે : જવાહરલાલ નહેરૂ, તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા : સુભાષચંદ્ર બોઝ, માય લાઈફ ઈઝ માય મેસેજ : **મહાત્મા ગાંધી**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

482. 'હિન્દ છોડો' લડત ક્યારે શરુ કરવામાં આવી ? - **8મી ઓગસ્ટ,1942ના રોજ**
483. ભારતમાં સૌ પ્રથમ ક્યા શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ? - **મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તામાં**
484. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને આપવામાં આવ્યુ? - **કોર્નવોલિસના**
485. અંગ્રેજોની કઈ નીતિથી ભારતના રજવાડાઓનું પતન થયું ? - **ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી**
486. ઉપનિષદોની આધ્યાત્મિક વિચારધારાથી પ્રભાવિત થઈને કોણે તેના ફારસી અનુવાદ કરાવ્યા હતા ? - **દારા શિકોહે**
487. પ્રાચીન વિશ્વનો આદ્ય કાયદાસંગ્રહ કોને માનવામાં આવે છે. - **મનુસ્મૃતિ**
488. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા ? - **ચક્રવર્તી સી.રાજગોપાલાચારી**
489. ધાર્મિક સાહિત્યમાં બૌદ્ધ ધર્મે ક્યા અમૂલ્ય ગ્રંથોનો વારસો આપ્યો છે ? - **ત્રિપીટક**
490. ક્યો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભુષણ' માનતો હતો ? - **ઔરંગઝેબ**
491. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી ? - **કુમારગુપ્ત**
492. ''બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ? - **ઈ.સ.1600માં**
493. ગાંધીજીએ 'વ્યક્તિગત સત્યાગ્રહ'ની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા ? - **વિનોબા ભાવે**
494. સંસ્કૃત ભાષાના ક્યા મહાકવિ સમ્રાટ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? - **બાણભટ્ટ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

495. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા ગાંધીએ કોની પ્રસંદગી કરી હતી ? - **અબ્બાસ તૈયબજી**
496. માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે ? - **પુરાતન પાષાણ યુગ**
497. હર્ષવર્ધન ક્યાં સ્થળે દર પાંચ વર્ષ ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો ? - **પ્રયાગમાં**

498. યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. **કનોજનો મહાપ્રતાપી રાજા : હર્ષવર્ધન,વાતાપીનો મહાપ્રતાપી રાજા : પુલકેશી બીજો, આચાર્ય શીલભદ્ર : નાલંદા વિદ્યાપીઠ, હર્ષચરિતના રચયિતા : મહાકવિ બાણભટ્ટ**

499. હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના કઈ હતી ? - **વેલેસ્લીની સહાયકારી યોજના**

500. યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. - **ઈ.સ.1506 : ફિરંગીઓએ ગોવા કબ્જે કર્યું , ઈ.સ.1757 : પ્લાસીનું યુદ્ધ, ઈ.સ.1764 : બક્સરનું યુદ્ધ, ઈ.સ.1765 : મીરજાફરનું અવસાન**

501. જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. - **ઈ.સ.1453 : ઈસ્તુંબલનું પતન, ઈ.સ.1498 : વાસ્કો દ ગામાનું ભારત આગમન, ઈ.સ.1510 : ફિરંગીઓએ ગોવાને વડુ મથક બનાવ્યુ, ઈ.સ.1818 : ત્રીજો મરાઠા વિગ્રહ**

502. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારાયેલી સિંહ મૂર્તિ ક્યા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે ? - **બૌદ્ધ**

503. બંગભંગની ચળવળના મુખ્ય ત્રણ લક્ષણો - **સ્વદેશી માલનો વેપાર કરવો, સંગઠન બનાવવું, વિદેશીમાલનો બહિષ્કાર કરવો.**

504. 'ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી' જેવા ઉત્સવો ઉજવવાનું કોણે શરૂ કર્યું? - **લોકમાન્ય ટિળક**

505. ક્યું સૂત્ર સુભાષચંદ્ર બોઝનું નથી ? - **તૂમ મુઝે ખૂન દો, મે તૂમ્હે આઝાદી દુંગા, ચલો દિલ્હી, જયહિંદ**

506. 'મિત્ર મેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ? - **વીર સાવરકર**

507. પુરાતન સમયના અવશેષોના ચોક્કસ સમય કાળને જાણવાની પદ્ધતિ કઈ ? - **કાર્બન ડેટિંગ પદ્ધતિ**

508. ક્યા ગવર્નર જનરલે ભારતમાં અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી ? - **લોર્ડ મેકોલે**

509. ક્યું જોડકું સાચુ છે ? - **લોર્ડ ડેલહાઉસી - દેશી રાજ્યો માટે ખાલસા નીતિ અખત્યાર, લોર્ડ વેલેસ્લી - સહાયકારી યોજના સંઘ બનાવી.**

510. દિલ્હીની ગાદી ઉપર શાસન કરનાર પ્રથમ મહિલા કોણ હતી ? - **રઝિયા બેગમ**

511. કઈ ગુફાઓમાં શિવજીનું પથ્થરનું ભવ્ય શિલ્પ 'ત્રિમૂર્તિ' આવેલું છે ? - **ઈલોરા ગુફાઓ**

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર કલાર્ક - 2012

512. 'સત્ય શોધક સમાજ'ના સ્થાપક કોણ હતા ? - **જ્યોતિબા ફૂલે**

513. 'બેલૂર મઠ' નીચેની પૈકી કઈ સન્માનીય વ્યક્તિએ સ્થાપેલ ? - **સ્વામી વિવેકાનંદ**

જૂનિયર કલાર્ક પેપર - 1 - 2012

514. સૌથી મોટા ઉપનિષદનું નામ આપો. - **બૃહદારણ્યક**

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

515. શંકરાચાર્ય અને મંડનમિશ્રના વાદવિવાદ વખતે ન્યાય તોળનાર ભારતીય મહિલા એટલે... - **મંડનમિશ્રની પત્ની**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

516. કોના મત મુજબ 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ?' - **કૌટિલ્ય**

517. ગુજરાતના વીર સપુત અને ભારતીય સૈન્યના પૂર્વ સરસેનાપતિનું નામ જણાવો. - **જનરલ માણેકશા**

સચિવાલય સિનિયર કલાર્ક - 2016

518. આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? - **1860**

TET- I - 2012/2014

519. સને 1939માં સુભાષચંદ્ર બોઝે ક્યા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી ? - **ફોરવર્ડ બ્લોક**

520. ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા ક્યા નામથી ઓળખાતી હતી ? - **વર્ધા શિક્ષણ યોજના**

521. 'ચૌરી ચૌરા' સ્થળ સાથે નીચેના પૈકી ક્યુ વિધાન સુસંગત છે ? - **અસહકારના આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું.**

522. માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? - **ચક્રવર્તી રાજગોપાલાચારી**

સબ ઓડિટર - 2015

523. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા ? - **અમીર ખુશરો**

524. ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ? - **લોકમાન્ય તિલક**

525. દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના ક્યા રાજાનો જન્મ થયો હતો? - **ઔરંગઝેબ**

TAT - 2012

526. ચાણક્ય.......... ના નામે પણ ઓળખાય છે. - **કૌટિલ્ય**

HTAT - 2012

527. પ્રાચીન વિદ્યાપીઠોમાંથી કઈ વિદ્યાપીઠનું સ્થાન હાલના ભારતમાં નથી. - **તક્ષશીલ વિદ્યાપીઠ**

528. ઝાંસીની રાણી નાનપણમાં ક્યા લાડકા નામથી ઓળખાતી હતી? - **છબીલી**

529. પ્રાચીન ઋષિ-મુનિઓએ માનવજાતિના કલ્યાણ અર્થે શાની આચારસંહિતા સૂચવી છે? - **યમ-નિયમની**

530. થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલ નામ - **કર્નલ આલ્કોટ, મેડમ બ્લેવેસ્કી, ડો.એની. બેસન્ટ**

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

531. કરેંગે યા મરેંગે - આ વાક્યના ઉદ્‌ગાતા કોણ છે? - **મહાત્મા ગાંધી**

532. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? - **સિદ્ધાર્થ**

PSI - 2012

533. પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ? - **અકબર અને હેમુ**

534. જમીનની તીવ્ર અસમાનાતા દૂર કરવા કોણે ભુદાન યજ્ઞ ચલાવ્યો હતો ? - **વિનોબા ભાવે**

535. મુસ્લીમ લીગના સ્થાપક કોણ હતા ? - **નવાબ સલીમઉલ્લાહ**

536. 1919માં દિલ્હીમાં મળેલા અખિલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ (પ્રમુખ) કોણ હતા ? - **શૌકત અલી**

537. નીચેનામાંથી સૌ પ્રથમ કોણે રૂપિયાના સિક્કા બહાર પાડયા હતા ? - **શેર શાહ**

538. સિમલા કરાર કોની કોની વચ્ચે થયા હતા ? - **ઈન્દિરા ગાંધી અને ભુટો**

539. જોડકું ? - **પાણિની-અષ્ટધ્યાયી, કૌટિલ્ય-અર્થશાસ્ત્ર, અશ્વઘોષ-બુદ્ધચરિત**

540. અકબરના દરબારના સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનું સાચુ નામ શું હતું ? - **રામતનુ પાંડે**

541. ઈતિહાસના પિતા (The Father of History) આ પદવી નીચેનામાંથી કોને ફાળે જાય છે ? - **હેરોડોટસ**

542. મહાત્મા ગાંધી 1932માં આમરણ ઉપવાસ પર બેસવાનુ મુખ્ય કારણ શું હતું? - **રામસે મેકડલનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડ ની જાહેરાત**

543. રામપ્રસાદ બિસ્મીલનું નામ શાની સાથે જોડાયેલ છે ? - **કાકોરી કાવતરુ**

544. ગૌતમ બુદ્ધએ ધર્મ ચક્ર પરીવર્તન નો સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપેલ? - **સારનાથ**

545. મહર્ષિ ચરક શાની સાથે સંકળાયેલા હતા ? - **ઔષધ**

PSI નશાબંધી - 2011

546. દેશનું સૌથી ઊંચુ મંદિર.......માં આવેલું છે, જેને ......મંદિર તરીકે ઓળખવામાં આવે છે. - **તાંજોર, બૃહદેશ્વર**

547. 'ઈન્ડિકા' પુસ્તકની રચના કોણે કરી ? - **મેગસ્થનીજ**

એકાઉન્ટ ઓફિસર - 1999

548. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ? - **વર્ધમાન**

549. ભારતમાં આવનાર સૌપ્રથમ ઈસ્લામિક પ્રજા કઈ હતી ? - **આરબો**

550. દીન-એ-ઈલાહી ધર્મની સ્થાપના કોણે કરી ? - **અકબર**

551. છેલ્લો મુઘલ બાદશાહ કોણ હતો ? - **બહાદુરશાહ ઝફર**

552. ગોરા નામની નવલકથાની રચના કોણે કરી ? - **રવીન્દ્રનાથ ટાગોર**

553. બૌદ્ધ ધર્મના મુખ્ય બે સંપ્રદાય ક્યા છે ? - **હિનયાન અને મહાયાન**

554. લોર્ડ વેલેસ્લી કઈ યોજના માટે જાણીતો હતો ? - **સહાયકારી યોજના**

555. 1857ના વિપ્લવમાં પ્રથમ શહીદ કોણ હતા ? - **મંગળ પાંડે**

556. મયુરાસન નામક સિંહાસન કોણે બનાવ્યું હતું ? - **શાહજહાં**

557. ભારતમાં અંગ્રેજોએ સૌપ્રથમ વ્યાપારી કોઠી ક્યા સ્થાપી ? - **સુરત**

558. હડપ્પન સંસ્કૃતિનો વિકાસ કઈ પ્રજાએ કર્યો ? - **દ્રવિડ**

559. સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થા સ્થાપી ? - **રામકૃષ્ણ મિશન**

560. 'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે' સૂત્ર આપ્યું - **લોકમાન્ય ટિળક**

561. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ક્યા થયો હતો ? - **અમૃતસર**

562. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા ક્યા વર્ષે કર્યા ? - **1905**

આંકડાકીય અધિકારી - 2000

563. મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું છે ? - **પાટલીપુત્ર**

564. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો ? - **તાંબુ**

565. મધ્યકાળમાં ઉત્તર ભારતમાં રામભક્તિનો પ્રચાર કરવામાં સૌથી વધુ કોનો ફાળો રહેલો છે ? - **રામાનંદ**

566. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપીયન પ્રજાનું શાસન સ્થપાયું ? - **પોર્ટુગીઝ**

567. હિન્દુ સમાજના નીતિ નિયમો દર્શાવતો પ્રાચીન ગ્રંથ ક્યો છે ? - **મનુસ્મૃતિ**

568. બંગાળનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા ? - **વોરન હેસ્ટિંગ્સ**

569. બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ કરી ? - **ક્લાઈવ**

570. ભારતમાં બ્રિટિશ તાજનું શાસન ક્યારે સ્થપાયું ? - **ઈ.સ.1858**

571. ટીપુ સુલતાનની રાજધાનીનું નામ શું હતું ? - **શ્રીરંગપટ્ટનમ્**

572. અભિનવ ભારત નામક ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોણે કરી? - **વિનાયક સાવરકર**

573. વંદે માતરમ્ સૌપ્રથમ ક્યા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું ? - **આનંદ મઠ**

574. કઈ હિંસાત્મક ઘટનાને કારણે અસહકારનું આંદોલન સ્થગિત રખાયું ? - **ચૌરીચોરા કાંડ**

575. ક્યા ક્રાંતિકારીએ જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા જનરલ ડાયરનું ખૂન કર્યું ? - **સરદાર ઉધમસિંહ**

576. ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાએ ક્યા શહેરમાં કર્ઝન વાઈલીની હત્યા કરી ? - **લંડન**

577. સમગ્ર હિંદમાં સૌપ્રથમ વસતી ગણતરી કોના સમયમાં થઈ ? - **લોર્ડ રિપન, 1881**

578. ઓપરેશન બ્લુ સ્ટારને કઈ બાબત સાથે સંબંધ છે ? - **સુવર્ણ મંદિર (અમૃતસર)**

579. ભારતના પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ કોણ હતા ? - **એની બેસન્ટ**

ચીફ ઓફિસર - 1999

580. 'જન ગણ મન'ના રચયિતા કોણ છે ? - **રવીન્દ્રનાથ ટાગોર**

581. ભારત માટે ઈન્ડિયા શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? - **યુનાની**

582. 'પંજાબ કેસરી' તરીકે કોણ જાણીતું છે ? - **લાલા લજપતરાય**

583. આઝાદ ભારતમાં કટોકટી ક્યા વર્ષે જાહેર થઈ ? - **1975**

584. પંચશીલ ભારતના ઈતિહાસની કઈ ઘટના છે ? - **ભારત-ચીન કરાર**

585. સૌથી મોટો ઉપનિષદ ક્યો છે ? - **બૃહદારણ્યક**

586. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ? - **કુમારગુપ્ત**

587. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? **એ.ઓ.હ્યુમ**

588. ભારતના મૂળ નિવાસી કોણ હતા ? - **દ્રવિડ**

589. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? - **1858**

મેડિકલ ટ્યૂટર - 2000

590. ઋતુસંહાર, શાકુંતલ, મેઘદૂત કોના દ્વારા રચિત કૃતિ છે? - **કવિ કાલિદાસ**
591. પ્રસિદ્ધ ભારતીય વિદ્યાપીઠ જે હાલ પાકિસ્તાનમાં છે તે કઈ? - **તક્ષશિલા વિદ્યાપીઠ**
592. પ્રાચીન સમયમાં અણુસિદ્ધાંત પર સંશોધન કરનાર ભારતીય ભૌતિક વિજ્ઞાની કોણ છે? - **કણાદ**
593. અષ્ટપ્રધાન મંડળ સાથે ક્યા શાસકનુ નામ જોડાયેલું છે? - **છત્રપતિ શિવાજી**
594. જૈન ધર્મના અંતિમ તીર્થંકર કોણ હતા? - **મહાવીર સ્વામી**

આયુર્વેદિક ડૉક્ટર - 2000

595. ભગવાન બુદ્ધનું વાસ્તવિક નામ શું હતું? - **સિદ્ધાર્થ**
596. 1857ના સ્વતંત્રતા સંગ્રામને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ તરીકે કોણે ઓળખાવેલું? - **વી.ડી. સાવરકર**
597. ઈ.સ.1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને કોણે ઉચ્ચારી હતી? - **સ્વામી વિવેકાનંદ**
598. ભારત-પાકિસ્તાન વચ્ચે સીમલા કરાર ક્યારે થયો? - **2 જુલાઈ, 1972**
599. જલિયાવાલા બાગની ઘટના ક્યા વર્ષે બની હતી? - **1919**
600. વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ કોણે આપી? - **મહાત્મા ગાંધી દ્વારા બારડોલીની મહિલાઓ**
601. બાબાસાહેબ આંબેડકરે ક્યો ધર્મ અપનાવેલ? - **બૌદ્ધ (નિઓ બૌદ્ધ)**
602. મુઘલોના આક્રમણથી મરાઠાઓને બચાવનાર મરાઠા વિરાંગના કોણ હતી? - **તારાબાઈ**

વૈદકિય સેવા - 2000

603. ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય? - **સમુદ્રગુપ્ત (ગુપ્ત સમ્રાટ)**
604. પંચતંત્રના રચયિતા કોણ હતા? - **વિષ્ણુ શર્મા**
605. પોર્ટુગીઝ ભારતમાં સૌપ્રથમ ક્યા બંદરે ઉતર્યા હતા? - **કાલીકટ**
606. ક્યા સુલતાને દિલ્હીથી દોલતાબાદ રાજધાની ખસેડી? - **મોહમ્મદ બિન તુઘલક**
607. 1911 પહેલા ભારતની રાજધાની કઈ હતી? - **કલકત્તા**
608. ભારતના ક્યા વડાપ્રધાનના સમયમાં બિનજોડાણવાદની નીતિએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો ભાગ ભજવ્યો? - **જવાહરલાલ નેહરુ**
609. મેઘદૂત ક્યા પ્રકારનું કાવ્ય છે? - **ઋતુ કાવ્ય**
610. ઈ.સ.1526માં બાબરે પાણીપતની લડાઈમાં કોને હાર આપી હતી? - **ઈબ્રાહિમ લોદી**
611. ક્યા મુઘલ બાદશાહના દરબારમાં ચિત્રશાળા શરૂ થઈ? - **અકબર**
612. અજંતાની ગુફામાં ક્યા ધર્મના ચિત્રો થયેલા છે? - **બૌદ્ધ**
613. જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થયા? - **24**

આંકડાકીય અધિકારી - 2000

614. 1962ની સાલ કઈ ઘટના સાથે સંબંધિત છે? - **ભારત-ચીન યુદ્ધ**
615. બીજાપુરનો ગોળ ગુંબજની ઊંચાઈ કેટલા ફૂટ છે? - **170 ફૂટ**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

616. ક્યો મુઘલ બાદશાહ નિરક્ષર હતો? : **અકબર**
617. પંચસિદ્ધાંતિકાના રચયિતા કોણ છે? : **વરાહમિહિર**
618. પ્રાચીન ભારતમાં નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે? : **ભરતમૂનિ**
619. ભગવદ્‌ગીતાનો પંદરમો અધ્યાય ક્યો છે? : **પુરુષોત્તમ યોગ**
620. 1857ની એન્ફિલ્ડ રાયફલના કારતૂસમાં ક્યા માસનું મિશ્રણ હતું? : **ગાય-ડુક્કર**
621. હિંદ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો? : **મહમ્મદ બિન કાસીમ**
622. ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેવાય? : **સંથારો**
623. આદિ જૈન ગ્રંથોની ભાષા કઈ હતી? : **પ્રાકૃત**
624. સૌથી જૂનો સ્મૃતિગ્રંથ ક્યો છે? : **મનુસ્મૃતિ**
625. દશરાજ્ય યુદ્ધનો વિજેતા રાજા સુદાસ કઈ ટોળીનો હતો? : **ભરત**
626. બહાદુરશાહ ઝફરનું મૃત્યુ ક્યા શહેરના કારાવાસમાં થયું હતું? : **રંગૂન**
627. ગીતા રહસ્ય ગ્રંથના લેખક કોણ છે? : **બાળ ગંગાધર ટિળક**
628. અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધાવ્યું? : **ગુરુ અર્જુનદેવ**
629. સલીમ તરીકે ઓળખાતો મુઘલ બાદશાહ ક્યો છે? : **જહાંગીર**
630. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર ક્યા શાસકોએ બંધાવ્યું હતું? : **ચૌલ**
631. મુદ્રારાક્ષસ પુસ્તકમાં કઈ બાબતનું વર્ણન જોવા મળે છે? - **ઉત્તર ભારતમાં ચંદ્રગુપ્ત કેવી રીતે સત્તામાં આવ્યો તેની વાત**
632. દિલ્હીનું જંતર-મંતર કોણે બનાવ્યું હતું? : **મહારાજા જયસિંહ બીજા**
633. તાનસેન અને બૈજુ બાવરાના ગુરુ કોણ હતા? : **સ્વામી હરિદાસ**
634. પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા ક્યા આવેલી છે? : **બિહાર**
635. 8 ઓગસ્ટ ક્યા કારણોસર પ્રસિદ્ધ થયો? : **ક્રાંતિ દિવસ**
636. કલ્પસૂત્ર ક્યા ધર્મનો ગ્રંથ છે? : **જૈન**
637. વરાહમિહિરનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું છે? : **ખગોળશાસ્ત્ર**
638. મહાભારતના યુદ્ધમાં કેટલી અક્ષૌહિણી સેના ભેગી થઈ હતી? : **18**
639. મેક્સમુલર અનુસાર આર્યોનું મૂળસ્થાન ક્યું ગણાય? : **મધ્ય એશિયા**
640. ક્યો એસિડ પ્રોટીનમાં હોય છે? : **એમિનો**
641. 1857માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે? : **મંગળ પાંડે**
642. બ્રહ્મો સમાજના સ્થાપક હતા? : **રાજારામ મોહન રાય**
643. ક્યા વાઈસરોયના સમયમાં ટપાલ ટિકિટ દાખલ થઈ? : **લોર્ડ ડેલહાઉસ**
644. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? : **વલ્લભાચાર્ય**
645. ગીત ગોવિંદના રચયિતા કોણ છે? : **જયદેવ**
646. કનિષ્ક ક્યા ધર્મના અનુયાયી હતા? : **બૌદ્ધ**
647. હર્ષવર્ધનના શાસનમાં ક્યા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી? : **હ્યુ એન સંગ**
648. ક્યા મુઘલ બાદશાહને પ્રમાણમાં બિનસાંપ્રદાયિક મનાય છે? : **અકબર**
649. સિંધુ નદીની સંસ્કૃતિના મકાનો શેમાંથી બનેલા હતા? : **ઈંટોના**
650. કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે? : **એકનાથ રાનડે**

651. ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી ? : **ગુરુ ગોવિંદસિંહ**
652. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી ? : **ઈ.સ. 78**
653. 1938 હરિપુરા અને 1939 ત્રિપુરા કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયેલ હતું ? - **સુભાષચંદ્ર બોઝ**
654. બૌદ્ધ ધર્મનું મૂળ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું હતું ? : **પાલિ**
655. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો ? : **શાહજહાં**
656. સારે જહાં સે અચ્છા ગીતના કવિ કોણ છે? : **ઈકબાલ**
657. ભગતસિંહ-સુખદેવ-રાજગુરુને ફાંસીની સજા ક્યારે કરવામાં આવી ? : **23 માર્ચ, 1931**
658. સાયમન કમિશનના વિરોધકમાં ક્યા નેતાનું અવસાન થયું ? : **લાલા લજપતરાય**
659. તક્ષશિલા ક્યા રાજ્યની રાજધાની હતી ? : **ગાંધાર**
661. નાગપુર ઝંડા સત્યાગ્રહ ક્યારે થયો હતો ? - **1923**
662. હડપ્પા કઈ નદીના કિનારે વસેલું નગર હતું ? : **રાવી**
663. આગ્રામાં લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો ? : **અકબર**
664. મુઘલ સમયમાં થયેલા મન્સુર ક્યા ક્ષેત્રે જાણીતા હતા ? : **ચિત્રકલા**
665. પંચતંત્ર કઈ ભાષામાં લખાયેલું હતું ? : **સંસ્કૃત**
666. બાણભટ્ટ ક્યા રાજાના દરબારની શોભા હતા ? : **હર્ષવર્ધન**
667. સીસાને ઢાળીને સિક્કા બનાવવાની શરૂઆત કોણે કરી હતી ? : **ક્ષત્રપ**
668. ભગવાન બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ ક્યા થયો છે? : **ત્રિપિટક**
669. ખેડૂતોને કૂવા ગાળવા, બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતો ? : **મહમદ બિન તઘલખ**
670. વિજયનગર સામ્રાજ્યના શ્રેષ્ઠ શાસક કોણ હતું ? : **કૃષ્ણ દેવરાય**
671. ભારતમાં લોદી વંશનો સ્થાપક કોણ હતો ? : **બહલોલ લોદી**
672. શિવાજી કોને પોતાના ગુરુ માનતા ? : **ગુરુ રામદાસ**
673. ભારત (હિન્દુસ્તાન)ના ભાગલા માટે ક્યા મુસ્લિમ નેતા જવાબદાર હતા ? : **મહંમદ અલી ઝીણા**
674. હિન્દુ ધર્મનું પુનરુત્થાન કોને આભારી છે ? : **શંકરાચાર્ય**
675. રામાનુજાચાર્યે ક્યો સિદ્ધાંત આપ્યો ? : **વિશિષ્ટાદ્વૈતવાદ**
676. ઈ.સ. 1526થી હિન્દુસ્તાનમાં કઈ મુસ્લિમ સત્તા શાસનમાં હતી ? : **મુઘલ સત્તા**
677. અમૃતસર શહેરની સ્થાપના કોણે કરી હતી ? : **ગુરુ રામદાસ**
678. અસતો મા સદ્ગમય ક્યા વેદમાંથી લેવામાં આવેલું છે? : **ઋગ્વેદ**
679. મહાભારતમાં ભિષ્મ પિતામહનું ઉપનામ શું હતું ? : **ગાંગેય**
680. શિવાજીએ ક્યા સેનાપતિનો વધ કર્યો હતો ? : **અફઝલખાન**
681. રામાયણમાં ક્યા વિમાનનો ઉલ્લેખ છે ? : **પુષ્પક વિમાન**
682. શિમલા પરિષદ અને વેવેલ યોજના સાથે ક્યુ વર્ષ સંબંધિત છે ? **1945**
683. ઈન્ડિયા વિન્સ ફ્રીડમના કર્તા કોણ છે? : **મૌલાના આઝાદ**
684. પ્લાસીનું યુદ્ધ ક્યા વર્ષમાં લડાયું હતું ? : **ઈ.સ. 1757**
685. હૈદરાબાદ રજવાડાનાં ભારતમાં વિલીનીકરણમાં ભાગ ભજવનાર ગુજરાતી કોણ છે ? : **કનૈયાલાલ મુનશી**
686. સાંખ્યદર્શનના રચયિતા કોણ છે? : **કપીલમુનિ**
687. મગધ સામ્રાજ્યની રાજધાની નગરી પાટલી પુત્ર હાલ ક્યા રાજ્યમાં છે ? : **બિહાર**
688. પ્રાચીન સમયના સર્જન તરીકે કોને ઓળખાય છે? : **સુશ્રુત**
689. ચિતરંજનદાસનું ઉપનામ જણાવો ? : **દેશબંધુ**
690. ક્યા નેતાએ સંપૂર્ણ ક્રાંતિની જાહેરાત કરી ? : **જયપ્રકાશ નારાયણ**
691. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? : **લોર્ડ કેનિંગ (પ્રથમ વાઈસરોય પણ)**
692. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ ખુલ્લી પાડી રાષ્ટ્રવાદ જગાવવામાં મદદ કરી હતી ? : દાદાભાઈ **નવરોજી (પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઈન્ડિયા થિયરી દ્વારા)**
693. યુગાંતર નામક અખબાર કોણે શરૂ કર્યું હતું ? : **બારીન્દ્ર ઘોષ**
694. 1902માં અમદાવાદ ખાતે મળેલ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા ? - **સુરેન્દ્રનાથ બેનરજી**
695. ક્યા વર્ષે ભારતને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું ? : **1935**
696. ગાંધીજીની હત્યા ક્યા સ્થળે થઈ હતી ? : **બિરલા ભવન**
697. ભારતના છેલ્લા મુસ્લિમ બાદશાહ કોણ હતા ? : **બહાદુરશાહ ઝફર**
698. ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતાં ? : **મૌલાના આઝાદ**
699. સૌથી છેલ્લે રચાયેલ વેદનું નામ શું છે? : **અથર્વવેદ**
700. રાજીવ ગાંધીની હત્યા કેસની તપાસ સાથે ક્યું પંચ સંકળાયેલું હતું ? : **જૈન પંચ**
701. અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં જીત્યું હતું? : **ઈ.પૂ. 261**
702. અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? : **લાલા લજપતરાય**
703. લાઈટ ઓફ એશિયા કોને કહેવાય છે? : **બુદ્ધ**
704. ભૂદાન ચળવળનો પ્રારંભ ક્યા વર્ષમાં થયો ? : **1951**
705. ઋગ્વેદમાં સંપત્તિનું મુખ્ય સ્વરૂપ ક્યું હતું ? : **પશુધન**
706. અરવિંદ ઘોષે ક્યું દર્શન આપ્યું ? : **દિવ્ય ચેતના**
707. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપ્યો ? : **ગાંધીજી**
708. ચાણક્ય (કૌટિલ્ય)એ ક્યા ગ્રંથની રચના કરેલી છે ? : **અર્થશાસ્ત્ર**
709. એમ.એન. રોયની ઓળખ હતી ? : નવ **માનવતાવાદી (સામ્યવાદી)**
710. ચીની પ્રવાસી હ્યુ એન સંગે પ્રાચીની મુલાકાત લીધી ત્યારે ક્યો પલ્લવ રાજવી રાજ કરતો હતો ? - **નરસિંહ વર્મન**
711. મરાઠા સંઘની સ્થાપના કરી હતી ? : **બાજીરાવ પ્રથમ**
712. ફતેહપુર સિકરી કોણે વસાવ્યું હતું? : **અકબર**
713. ક્યા ગ્રીક સેનાપતિએ તેની પુત્રી હેલનના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા હતા ? : **સેલ્યુકસ નિકેટર**
714. આઝાદી સમયે કાશ્મીરના રાજા કોણ હતા ? : **મહારાજા હરિસિંહ**
715. મહર્ષિ વેદવ્યાસના પિતા કોણ હતા ? : **પરાશર**
716. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામા તીર્થંકર છે ? : **ચોવીસમાં**
717. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યા શહેરમાં આવેલ છે ? : **દિલ્હી**
718. વાસ્કો-દ-ગામા જે રસ્તે ભારત આવેલ, તે 'કેપ ઓફ ગુડ હોપ' ક્યાં ખંડમાં આવેલ છે ? : **આફ્રિકા**

719. કોણે ગુજરાતમાં 1907માં યુવાનોને ઉદ્દામમતવાદી યુદ્ધમાન પ્રવૃત્તિની તાલીમ આપવા ગંગનાથ ભારતીય સર્વ વિદ્યાલયની સ્થાપના કરી ? - **બારીન્દ્ર ઘોષ**

720. પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ ગણાય છે? : **દ્રવિડીયન**

721. દિલ્હી સલ્તનતમાં જમીનની માપણી માટે .... શબ્દ વપરાતો હતો. - **મસાહત**

722. દ્રવિડીયન કુળની માતૃભાષા કઈ ગણાય ? : **તમિલ**

723. આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટી કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? : **એન.એન. ઘોષ**

724. અંગ્રેજી તથા વિજ્ઞાનના ગ્રંથોનું ઉર્દૂમાં અનુવાદ કરતા ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? - **સર સૈયદ અહમદખાન**

725. મુઘલ બાદશાહ હુમાયુએ બંગાળને ક્યુ નામ આપેલું ? - **જન્નતાબાદ**

726. રોબર્ટ ક્લાઈવે સૌપ્રથમ ક્યા સ્થળે દ્વિમુખી શાસન પદ્ધતિ અપનાવી ? - **બંગાળ**

727. કોના મૃત્યુ બાદ સિંધુ નદી પર ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું ? - **એલેકઝાન્ડર ધી ગ્રેટ**

728. ડૉ.બી.આર.આંબેડકરે.............ના મુદ્દા બાબતે નેહરુ મંત્રીમંડળમાંથી કાયદા પ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. - **હિંદુ કોડ બીલ**

729. ડોમિન્ગો પેસ ક્યા વિસ્તારના પ્રવાસી હતા ? - **પોર્ટુગીઝ પ્રવાસી**

730. પાણીપતના પ્રથમ યુદ્ધની સાલ જણાવો. - **1526**

731. ક્યા સમયગાળાને અશ્વમેધ પુનરુદ્ધાર યુગ તરીકે ગણનામાં લેવાય છે ? - **શુંગ વંશ**

732. આર્યવર્તના નવ રાજાઓને હરાવનાર ગુપ્ત સમ્રાટ ક્યો છે ? - **સમુદ્રગુપ્ત**

733. ક્યો મુઘલ બાદશાહ વીણા વગાડવામાં કુશળ મનાય છે ? - **ઔરંગઝેબ**

734. પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તરીકે ભારત આવનાર વ્યક્તિ કોણ છે ? - **અલ્મેડો**

735. કોણે સ્વરાજ પાર્ટી શરૂ કરી હતી ? - **ચિતરંજનદાસ અને મોતીલાલ નેહરુ**

736. સ્કંદગુપ્તની વિગત ક્યા અભિલેખમાંથી પ્રાપ્ય થાય છે ? - **ભીતરી અભિલેખ**

737. ટીપુ સુલતાનનું અવસાન ક્યા યુદ્ધ દરમિયાન થયું હતું ? - **ચોથું એંગ્લો-મૈસૂર યુદ્ધ**

738. વડાપ્રધાન બનનાર રાજ્યસભાના પ્રથમ સાંસદ કોણ હતા ? - **ઈન્દીરા ગાંધી**

739. મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારાનું વર્ષ જણાવો. - **1919**

740. ઈબ્ન બતુતાહની યોગ્ય વિગત જણાવો. - **મોરક્કન પ્રવાસી**

741. ત્રણ સમુદ્રોના પાણી પીનારાની ઉપમા કોને પ્રાપ્ત થયેલી છે ? - **શાતકર્ણી**

742. દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517માં કોની નિમણૂક થઈ હતી? - **સીલેક્ષ**

743. અભિનવ ભારત સોસાયટીના સ્થાપક કોણ છે ? - **વી.ડી.સાવરકર**

744. ચાંદબીબીને ક્યા વિસ્તારની શાહજાદી મનાય છે ? - **અહમદનગર**

745. બલખના વાહલિકોને હરાવનાર ગુપ્ત સમ્રાટ કોણ છે ? - **ચંદ્રગુપ્ત બીજો**

746. શિલ્પવેદ ક્યા વેનો ઉપવેદ છે ? - **અથર્વ વેદ**

747. અભિજ્ઞાનશાકુંતલમમાં કઈ બાબતનું વર્ણન મળે છે ? - **પ્રેમ અને રોમાંચના વિષયવસ્તુ પર આધારિત**

748. ઈલોરાનું કૈલાસ મંદિર ક્યા રાષ્ટ્રકૂટ રાજવીએ બંધાવ્યું હતું ? - **કૃષ્ણ પહેલો**

749. ક્યા ક્રાંતિકારીએ લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી હતી ? - **મદનલાલ ઢીંગરા**

750. અકબરની ધાઈમાતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? - **માહમ અનગા**

751. એથેનેસીયસ નીકીટીઅનની પ્રવાસી તરીકે ઓળખ જણાવો. - **રશિયન પ્રવાસી**

752. પ્રાચીન ભારતીય ઈતિહાસમાં દ્વિતીય અશોક તરીકે કોણ નામાંકિત છે ? - **કનિષ્ક**

753. હુણોને હરાવનાર ગુપ્ત સમ્રાટ કોણ છે ? - **સ્કંદગુપ્ત**

754. ચૌલ શાસને દરમિયાન 'રામાવતારમ્'ની રચના કોણે કરી હતી ? - **કમ્બન**

755. ક્યા શાસક ગુલરૂપી ઉપનામથી કવિતાઓની રચના કરતા હતા ? - **સિકંદર લોદી**

756. પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે, આ વાક્ય કોણે કહ્યું છે ? - **કૌટીલ્ય**

757. દુર્ગાવતી ક્યા વિસ્તારના રાણી હતા ? - **ગોંડવાના**

758. કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ? - **કસ્તુરબા, મણીબેન પટેલ, મૃદુલા સારાભાઈ**

759. નીકોલા કોન્ટી પ્રવાસી હતા ? - **વેનીસીયન પ્રવાસી**

760. ઉત્તરમીમાંસાના રચયિતા કોણ છે ? - **બાદરાયણ**

761. ક્યા વાઈસરોય ઓવન મેરિડીથના નામે ઓળખાતા હતા ? - **લોર્ડ લિટન**

762. સંસ્કૃત ભાષા ક્યા સમયખંડમાં રાજભાષા બની હતી ? - **ગુપ્તકાળ**

763. ક્યા સુધારામાં ભારતના રાજવીઓ માટે નરેન્દ્ર મંડળ રચવાની દરખાસ્ત કરવામાં આવી હતી ? - **ઈ.સ.1919માં મોન્ટફર્ડ સુધારામાં**

764. ઈસુંની બીજી સદીમાં ટોલેમીએ દુનિયાનો એક પ્રાથમિક નકશો બનાવ્યો હતો આ વિધાન ? - **સાચું છે**

765. હરિહર અને બુક્કાએ ક્યા સામ્રાજ્યની સ્થાપના કરી હતી ? - **વિજયનગર સામ્રાજ્ય**

766. ટ્રીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે ? - **પ્રથમ એંગ્લો-મૈસૂર યુદ્ધ**

767. ક્યા વેદમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે ? - **ઋગ્વેદ**

768. પલ્લવોના રાજ્યની રાજધાની કઈ હતી ? - **કાંચીપુરમ**

769. શાહજહાં પુરમાં આર્યસમાજના મંદિર ઉપર થયેલો હુમલો ક્યા ક્રાંતિકારીએ રોક્યો હતો ? - **અશફાક ઉલ્લાખાં**

770. બંગાળમાં હુગલીમાંથી ક્યારે અને કોના દ્વારા પોર્ટુગીઝોને હાંકી કાઢવામાં આવ્યા ? - **1631- કાસિમ ખાન**

771. રાજા રામમોહન રાયનો જન્મ ઈ.સ.1772માં બંગાળના ક્યા જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો ? - **હુગલી**

772. ક્યા ધારા હેઠળ રાજકીય બાબતો માટે બ્રિટનની સરકારે છ સભ્યોના બોર્ડ ઓફ કન્ટ્રોલની નિમણૂક કરી બોર્ડને હિંદમાં રહેલા બ્રિટનના સંસ્થાઓના દીવાની અને ફોજદારી શાસનની બધી જ કામગીરીના નિરીક્ષણ, નિર્દેશન અને અંકુશની સત્તા આપવામાં આવી હતી ? - **પિટનો ઈન્ડિયા ધારો, 1784**

773. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી ? - **તુંગભદ્રા**

774. ભક્તિ ચળવળ દરમિયાન મહાદેવાચાર્ય સાથે શું સંબંધિત છે ? - **દ્વૈત તત્ત્વજ્ઞાન**

775. ટ્રીટી ઓફ મેંગલોર ક્યા યુદ્ધ દરમિયાન થઈ હતી ? - **બીજું એંગ્લો-મૈસૂર યુદ્ધ**

776. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે- આ વિધાન કોનું છે ? - **ગાંધીજી**

777. ઈ.સ.1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી નામનું સમાચારપત્ર કોણે શરૂ કર્યું હતું ? - **રાજા રામમોહન રાય**

778. વૈદિક સાહિત્ય અને માનવીના આચરણની બાબતો ક્યા ગ્રંથમાં જોવા મળે ? - **બ્રાહ્મણ ગ્રંથ**

779. યુરોપમાં ભારતની આઝાદી માટે કોણે સેન્ય સંયોજિત કર્યું હતું ? - **લાલા હરદયાળ**

780. સંસ્કૃત ભાષાના વ્યાકરણ 'અષ્ટાધ્યાયી'ની રચના કોણે કરેલી છે ? - **પાણિની**

781. પાણીપતના બીજા યુદ્ધનું વર્ષ જણાવો. - **1556**

782. સ્વામી માધવ વિદ્યારણ્ય અને સ્વામી સાંયણાચાર્યની પ્રેરણાથી ક્યા સામ્રાજ્યની સ્થાપના થઈ હતી ? - **વિજયનગર સામ્રાજ્ય**

783. ભક્તિ ચળવળ દરમિયાન શૈવવાદ સાથે ક્યા મહાનુભાવ સંબંધિત છે ? - **શંકરાચાર્ય**

784. ટ્રિટી ઓફ મદ્રાસ ક્યા યુદ્ધમાં થઈ ? - **પ્રથમ એંગ્લો-મૈસુર યુદ્ધ**

785. ક્યા વેદમાં જાદુઈ ચિત્તાકર્ષક શક્તિ અને જાદુમંત્રોનો સમાવેશ થાય છે ? - **અથર્વ વેદ**

786. સ્થુલીભદ્ર અને ભદ્રબાહુ ક્યા ધર્મના બે મહાન આચાર્ય હતા ? - **જૈન ધર્મ**

787. દેશમાં પ્રથમવાર આવક વેરો નાખવાની શરૂઆત ક્યા ગવર્નર જનરલ અને વાઈસેરોયના સમયમાં થઈ હતી ? - **લોર્ડ કેનિંગ**

788. ટ્રીટી ઓફ સેરીંગપટ્ટનમ ક્યા યુદ્ધ સાથે સંકળાયેલી છે ? - **ત્રીજુ એંગ્લો-મૈસુર યુદ્ધ**

789. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા.ભારતમાં ક્યા કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો ? - **ધ ચાર્ટર એક્ટ, 1853**

790. વૈદિક સાહિત્યના ક્યા ગ્રંથમાં અનેક સંસ્કારોની વિગત આપેલી છે ? - **આરણ્યકો**

791. કોલકાતામાં હિંદુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ? - **રાજા રામમોહન રાય**

792. સ્વદેશ સેવકના સ્થાપક કોણ છે ? - **જી.ડી.કુમાર**

793. ખિલાફત આંદોલન ક્યારે થયું હતું ? - **1920**

794. વિજયનગર સામ્રાજ્યની રાજભાષા જણાવો. - **તેલુગુ**

795. વેદાંગ સાથે ક્યા ભારતીય રાજ્યને જોડી શકાય ? - **પંજાબ**

796. ભક્તિ ચળવળ દરમિયાન બસવા ક્યા સંપ્રદાય સાથે સંબંધિત છે ? - **લીંગાયત સંપ્રદાય**

797. અકબરે 'જગતગુરૂ'ની ઉપાધિ ક્યા સંતને આપી હતી ? - **હિરવિજય સૂરી**

798. પ્રાંતિક સ્વરાજ્ય સાથે ક્યું વર્ષ જોડાયેલું છે ? - **ઈ.સ.1935**

799. હડપ્પીયન સંસ્કૃતિમાંથી મળી આવેલ મોહેં-જો-દડો નગર વિશે કઈ બાબત યોગ્ય છે ? - **નાના-મોટા રસ્તા કાટખૂણે મળતા, નગરમાં ગટર યોજના હતી, જાહેર સ્નાનાગારની વ્યવસ્થા હતી**

800. દિલ્હી સલ્તનતના ક્યા સુલતાને સૈનિકોના હુલિયા લખવાની શરૂઆત કરાવી હતી ? - **અલાઉદીન ખલજી**

801. અમદાવાદ ટેક્સટાઈલ લેબર એસોસીએશનના સ્થાપક કોણ હતા ? - **મહાત્મા ગાંધી**

802. ભક્તિ ચળવળે દરમિયાન પરમાર્થ સાથે કોણ સંબંધિત હતું ? - **રામદાસ**

803. ક્યા સમ્રાટની માહિતી માટે હાથીગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્રોત છે ? - **ખારવેલ**

804. મહર્ષિ સુશ્રુત ક્યા ક્ષેત્રમાં યોગદાન આપેલું છે ? - **શૈલ્ય ચિકિત્સા**

805. વીર સાવરકરને ક્યા આજીવન કાળાપાણીની સજા થઈ હતી ? **પોર્ટબ્લેર**

806. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? - **1757**

807. ફ્રી હિન્દુસ્તાનના સ્થાપક તરીકે કોને ઓળખાય છે ? - **તારકનાથ દાસ**

808. મહિલા રાજકુમારી અમૃત કૌર ક્યા ખાતાના ભારત સરકારના મંત્રી હતા ? - **આરોગ્ય**

809. બ્રિટીશ ઈન્ડિયન એસોસિએશનના સ્થાપક કોણ હતા ? - **દેવેન્દ્રનાથ ટાગોર**

810. ભારતીય ઈતિહાસમાં તરંગી સુલતાનનું બિરુદ કોને મળેલું છે ? - **મહંમદ બિન તઘલક**

811. પાગપંથી બળવાના નેતા કોણ હતા ? - **ટીપુ શાહ**

812. 8 એપ્રિલ, 1928ના રોજ ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો ? - **ભગતસિંહ**

813. સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ કઈ ધાતુની છે ? - **કાંસુ**

814. લાલા લજપતરાયે ક્યા કમિશનનો વિરોધ કર્યો હતો ? - **સાયમન કમિશન**

815. સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે ? - **કપિલમુનિ**

816. ભારતના પ્રથમ મંત્રીમંડળમાં સરદાર બલદેવસિંહ ક્યું ખાતું ધરાવતા હતા ? - **સંરક્ષણ**

817. ફોરવર્ડ બ્લોકના સ્થાપક કોણ હતા ? - **સુભાષચંદ્ર બોઝ**

818. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? - **બાબર અને ઈબ્રાહીમ લોદી**

819. વરાહ મિહિરનું યોગદાન જણાવો. - **જ્યોતિષ**

820. કોણે સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસુલ ઉઘરાવ્યું હતું ? - **અલ્લાઉદ્દીન ખીલજી**

821. ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાગાડી ઉપર કોણે બોમ્બ ફેક્યો હતો ? - **પ્રફુલ્લ ચાકી**

822. 'શિશુપાલવધ' કોણે રચેલું છે ? - **માઘ**

823. હિંદુઓ પરત્વેની અકબરની નીતિના સંદર્ભમાં યોગ્ય બાબત જણાવો. - **તેણે યાત્રા વેરો અને જજિયા વેરો નાબૂદ કર્યો હતો**

824. રામોસીસ બળવાના નેતા કોણ હતા ? - **ચિતુરસિંહ**

825. ક્યા ગુપ્ત સમ્રાટે મહરોલીના લોહસ્તંભનું નિર્માણ કરાવ્યું હતું ? - **ચંદ્રગુપ્ત બીજો**

826. વૈષ્ણવ ધર્મના પુષ્ટિમાર્ગના સ્થાપક એવા તેલંગણ બ્રાહ્મણ કોણ હતા ? - **વલ્લભાચાર્ય**

827. 22 ઓગસ્ટ, 1947ના રોજ રચાયેલા ભારતના પ્રથમ મંત્રીમંડળમાં રેલવે અને પરિવહન મંત્રી પદે બિરાજમાન હતા ? - **ડૉ.જોન મથાઈ**

828. ટ્રિટી ઓફ સેરિંગપટનમ ક્યા યુદ્ધ દરમિયાન થઈ ? - **ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ**

829. ક્યા અંગ્રેજ ગવર્નર જનરલે મહેસૂલ વ્યવસ્થામાં સ્થાયી બંદોબસ્તની શરુઆત કરી હતી ? - **લોર્ડ કોર્નવોલિસ**

830. આર્યભટ્ટ કઈ બાબત સાથે સંબંધિત છે ? - **ગણિતશાસ્ત્ર**

831. દોલતાબાદ કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? - **મહારાષ્ટ્ર**

832. જહોન મીડનહોલે ક્યા મોગલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ફરમાન લેવાનો પ્રયત્ન કર્યો ? - **અકબર**

833. ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન ક્યું હતું ? - **એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ**

834. ટ્રિટી ઓફ મેંગલોર ક્યા યુદ્ધ સમયે થઈ ? - **બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ**

835. વેપાર માર્ગમાં ચીનનો જમીન માર્ગનો ક્યા સમયમાં ઉમેરો થયો હતો ? - **ગુપ્ત યુગ**

836. રાજકવિ હરિષેણ ક્યા શાસકના દરબારી કવિ હતા ? - **સમુદ્રગુપ્ત**

837. હડપ્પન સંસ્કૃતિની મૂર્તિઓ ક્યા પદાર્થમાંથી બનેલી હતી ? - **પથ્થર, કાસું અને તાંબુ**

838. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 બંધનનું એક નવીન ચાર્ટર છે એવું કોણે કહ્યું ? - **પંડીત જે.એલ. નહેરુ**

839. ચાર મિનાર સાથે જોડાયેલું રાજ્ય ? - **આંધ્ર પ્રદેશ**

840. શૈક્ષણિક સુધારા માટે ક્યા વાઈસરોયે વિલિયમ હંટરની અધ્યક્ષતામાં ઓયોગની રચના કરી હતી ? - **લોર્ડ રિપન**

841. ઉપનિષદનો અર્થ શું થાય છે ? - **ગુરુ પાસે બેસીને શીખવાની વિદ્યા**

842. જિંજીનો કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? - **તમિલનાડુ**

843. ક્યા કરાર સંદર્ભે પ્રાન્ત વિધાનસભામાં વંચિત વર્ગો માટે આરક્ષિત બેઠકો વધારવામાં આવી ? - **પુના કરાર**

844. ગુરુ રવિદાસ મેમોરિયલ ક્યા રાજ્યમાં આવેલું છે ? - **પંજાબ**

845. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ ઈલોરાની ગુફાઓ વિશે જણાવો. - **કુલ 34 ગુફાઓ છે. 13થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની છે, વિશેષ આકર્ષણ કૈલાસ મંદિર છે**

846. ભાગવત ચળવળના બાર વૈષ્ણવ આલવાર પૈકીના એક માત્ર સાધ્વી...... હતા.- **અન્દલ**

847. બારડોલી સત્યાગ્રહનું વર્ષ જણાવો. - **1928**

848. પરદેશીઓની વેપારી કોઠી યોગ્ય રીતે જોડો. - **પોર્ટુગલ-કાલીકટ, ડચ-પુલિકટ, અંગ્રેજો-સુરત, ફ્રેન્ચ-પોંડીચેરી**

849. અલાઉદ્દીન ખલજીએ દુધારુ પશુઓ પર ક્યો કર લાગુ કર્યો હતો? - **ચરાઈ કર**

850. અમીર ખુશરોનું યોગદાન જણાવો. - **તેઓ કવિ, ઈતિહાસકાર અને સંગીતકાર હતા**

851. ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષ નામના રાજવીઓ ક્યા વંશના હતા ? - **રાષ્ટ્રકૂટ**

852. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનું પ્રિય શિર્ષક શું હતું ? - **ક્રમાદિત્ય**

853. મહાભાષ્યના રચયિતા કોણ છે ? - **પતંજલિ**

854. જાણીતું પુસ્તક બંદીજીવન.............નામના ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાનીએ લખ્યું છે ? - **સચિન્દ્રનાથ સાન્યાલ**

855. નવગ્રહ મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ? - **આસામ**

856. 1857ના વિપ્લવ સમયે ગવર્નર જનરલ કોણ હતા ? - **લોર્ડ કેનિંગ**

857. ઋગ્વેદના મોટાભાગના મંત્રોને ....શ્રેણીમાં મુકીને સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ. - **ઉદ્દત, અનુદાત અને સ્વરિત**

858. ક્યા ચાર્ટર એક્ટ મુજબ શિક્ષણ પેટે રૂ.1 લાખનું અનુદાન જાહેર થયું ? - **1813**

859. ફતેહપુર સિક્રી ખાતે આવેલા ઈબાદત ખાનાનો ઉપયોગ ક્યા હેતુ માટે થતો હતો ? - **અલગ-અલગ ધર્મના જાણકારો સાથે અકબર ધર્મની ચર્ચા કરતો**

860. લોર્ડ ડેલહાઉસીએ સૌપ્રથમ ખાલસા નીતિ હેઠળ ખાલસા કર્યું. - **સતારા**

861. મોહેં-જો-દડો સિંધુ નદીના કિનારે તો હડપ્પા કઈ નદીના કિનારે ? - **રાવી**

862. વૈદિક ધર્મનો પુનરુદ્ધાર તથા સામાજિક સુધારણા કઈ સંસ્થાનો ઉદ્દેશ હતો - **આર્ય સમાજ**

863. ભારતનો સૌથી મોટો ઘુમ્મટ ક્યો છે? - **ગોળગુંબજ, બિજાપુર**

864. ક્યા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરે છે ? - **અથર્વવેદ**

865. આમીર ખુશરોના ગુરુ કોણ હતા ? - **હજરત નિઝામુદીન ઓલીયા**

866. 'સ્વપ્નવાસવદત્તમ્ના સર્જક કોણ છે ? - **ભાસ**

867. ક્યો કરાર મહાત્મા ગાંધી અને બી.આર. આંબેડકર વચ્ચે થયો હતો ? - **પુના કરાર**

868. કાંગડાનો કિલ્લો ક્યા રાજ્યમાં સ્થિત છે ? - **હિમાચલ પ્રદેશ**

869. 'માલતીમાધવ'ના રચયિતા કોણ છે ? - **ભવભૂતિ**

870. દિલ્હી સલ્તનતના એકમાત્ર સુલતાન જણાવો કે જેઓએ પોતાની આત્મકથા લખી હોય ? - **ફિરોજશાહ તઘલક**

871. હડપ્પાના નગરોમાં ચણતર કામમાં કઈ બાબતનો ઉપયોગ થયેલ છે ? - **પાકી ઈંટોનો**

872. સ્યાદવાદનો સિદ્ધાંત ક્યા ધર્મ સાથે સંકળાયેલો છે ? - **જૈન ધર્મ**

873. બૌદ્ધ સંઘમાં સ્થાન પામનાર પ્રથમ સ્ત્રી કોણ હતા ? - **પ્રજાપતિ ગૌતમી**

874. ક્યા વર્ષે આર્મ્સ એક્ટ પસાર થયો હતો ? - **ઈ.સ.1878**

875. બ્રિટીશ શાસનની રૈયતવારી પ્રથા સર થોમસ મનરોએ સૌપ્રથમ ક્યા પ્રાંતમાં દાખલ કરી હતી ? - **મદ્રાસ**

876. કાન્હરી ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ? - **મહારાષ્ટ્ર**

877. મેગાસ્થનીઝે ક્યા શાસકના દરબારમાં રહીને 'ઈન્ડિકા' ગ્રંથની રચના કરી ? - **ચંદ્રગુપ્ત મૌર્ય**

878. ભારતના સ્વતંત્રતા દરમિયાન કોણે પરદેશમાં રહીને સ્વતંત્રતા માટે પ્રયત્નો કરેલ - **શ્યામજીકૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, માદામ ભિખાઈજી કામા**

879. અસિકા નૂહ, સિપિહર જેવી કૃતિઓ કોણ લખેલી છે ? - **આમીર ખુશરો**

880. રોજડી ભાદર નદી કિનારે તો લોથલ કઈ નદીના કિનારે ? - **ભોગાવો**

881. ગુપ્ત સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક કોણ હતા ? - **ચંદ્રગુપ્ત પ્રથમ**

882. મુઘલોની રાજભાષા કઈ હતી ? - **ફારસી**

883. ક્યા ગુરુએ ગુરુમુખી લિપિની રચના કરી હતી ? - **અંગદેવ**

884. વરાહમીહિરના 'બૃહદસંહિતા' ગ્રંથમાં કઈ માહિતી જોવા મળે છે ? - **આકાશી ગ્રહો અને તેની મનુષ્ય પર અસર, મનુષ્યોના લક્ષણોનું વર્ણન, ભૂગર્ભજળનો પત્તો લગાવવાના માર્ગદર્શક મુદ્દાઓ, લગ્ન સ્થળ, તળાવો, કૂવાઓ, ખેતરમાં વાવણી વગેરે પ્રસંગના મુહૂર્તોની વિગત**

885. હાર્ટોગ કમિશન કઈ બાબત સાથે સંબંધિત હતું ? - **શિક્ષણ**

886. હોમરુલ લીગની સ્થાપના કોણે કરી હતી ? - **બાળ ગંગાધર ટિળક અને એની બેસન્ટ અને અન્ય**

887. કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાયસરોય એમ બંને હતા ? - **લોર્ડ કેનિંગ**

888. ક્યા કાયદા હેઠળ બ્રિટીશ તાજે ભારત સરકારનો વહીવટ હસ્તગત કર્યો ? - **The govenement of India Act, 1858**

889. અલાઈ દરવાજાની રચના કોણે કરાવી હતી ? - **અલાઉદ્દીન ખીલજી**

890. લક્ષ્મીબાઈ ક્યા શાસકના રાણી હતા ? - **ગંગાધરરાવ**

891. ક્યા વર્ષના કલકત્તા અધિવેશનમાં પહેલી વખત 'જન ગણ મન' ગવાયું હતું ? - **1911**

892. ક્યા અંગ્રેજ ગવર્નરે બોર્ડ ઓફ રેવન્યૂની સ્થાપના કરી હતી ? - **વોરન હેસ્ટિંગ્સ**

893. ક્યા ગવર્નર પોતાને બેંગાલ ટાઈગર તરીકે ઓળખાવતા હતા? - **વેલેસ્લી**

894. હિટ્ટાઈટ અને મિતાન્ની વચ્ચે થયેલ સંધિના દસ્તાવેજોમાં વૈદિક ભગવાનના નામ જોવા મળે છે તે દસ્તાવેજો કઈ જગ્યાએથી પ્રાપ્ત થયેલા છે ? - **બોગાઝકાસે (બોગઝકેઈ-તુર્કી)**

895. સૌથી પ્રાચીન પુરાણ ક્યું છે ? - **મત્સ્યપુરાણ**

896. ક્યા પ્રાચીન સ્થળેથી મળી આવેલા મોટા ખાસ તળાવને પુરાતત્વવિદો મોટુ સ્નાનાગાર કહે છે ? - **મોહેં-જો-દડો**

897. સર વિલિયમ વિલ્સન હન્ટરની અધ્યક્ષતા હેઠળ ભારતીય શિક્ષણ આયોગની નિમણૂક કોણે કરી હતી ? - **લોર્ડ રિપન**

898. ગોલકોંડાનો કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? - **આંધ્ર પ્રદેશ**

899. કેમ્પબેલ કમિશન કઈ બાબત માટે રચાયેલું હતું ? - **દુષ્કાળ**

900. ઉપનિષદો.........- **હિન્દુ ફિલસૂફીના સ્રોત છે**

901. પૂર્વમીમાંસાના રચયિતા કોણ છે ? - **જૈમિની**

902. ક્યા ગવર્નર જનરલે પ્રથમવાર જ પોસ્ટ ટિકિટો દાખલ કરી હતી? - **ડેલહાઉસી**

903. પ્રાચીન ભારતમાં બે પ્રકારના શિક્ષકો હતા તે જણાવો. - **ઉપાધ્યાય અને આચાર્ય**

904. હિંદ છોડો ચળવળ (1942)માં કઈ પાર્ટીએ સહકાર આપ્યો ન હતો ? - **ધી હિન્દુ મહાસભા, ધી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, ધી યુનિયનિસ્ટ પાર્ટી ઈન પંજાબ**

905. વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? - **2 સપ્ટેમ્બર, 1946**

906. ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના મહાભિનિષ્ક્રમણમાં સૂચવાયેલ છે ? - **ગૃહ ત્યાગ**

907. મેન્સફિલ્ડ કમિશન શા માટે રચાયું હતું ? - **ચલણ**

908. હરપ્પન ઈંટ મુખ્યત્વે......... - **ખુલ્લા ઘાટમાં બનાવવામાં આવતી હતી**

909. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા ? - **ઈન્ડો-ગ્રીક**

910. અકબરનો જન્મ ..... ખાતે થયેલ હતો. - **અમરકોટ**

911. ગદર શું હતું ? - **ભારતીય ક્રાંતિકારીઓનું સંગઠન જેનું મુખ્યમથક સાનફ્રાન્સિસ્કોમાં હતું**

912. બીજા પરશુરામ તરીકે કોને ઓળખવામાં આવે છે ? - **મહાપદ્મનંદ**

913. હરિહર અને બુક્કા રાય શાસકો ક્યા વંશના હતા ? - **સંગમ વંશ**

914. ક્યા યુદ્ધથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો? - **1757નુ પ્લાસીનું યુદ્ધ**

915. જૈન ધર્મમાં સંપૂર્ણ જ્ઞાનને .... તરીકે ઓળખવામાં આવે છે. - **કૈવલ્ય**

916. હિંદ સ્વતંત્રતાના પ્રસ્તાવમાં કુલ કેટલી કલમો હતી ? - **20 કલમો**

917. 'રઘુવંશ'ની રચના ક્યા મહાનુભાવે કરેલી છે ? - **કાલિદાસ**

918. ક્યા પ્રાચીન સ્થળોએથી અગ્નિકુંડો મળેલ છે ? - **કાલીબંગા અને લોથલ**

919. સલ્તનત યુગના અકબર તરીકે કોની ગણના થાય છે ? - **ફિરોજશાહ તઘલક**

920. સ્વરાજ પક્ષની સ્થાપનાનું વર્ષ ક્યું હતું ? - **1923**

921. અમીની કમિશનનો હેતુ શું હતો ? - **જમીન મહેસૂલ**

922. પ્રાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શું કહેવાતું ? - **ઉપાધ્યાય**

923. સ્કંદગુપ્તનો ક્યો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે ? - **ભીતારી શિલાલેખ**

924. માલિક તેરી રજા રહે ઔર તુ હી તુ રહે, બાકી ન મૈં રહું, ન મેરી આરઝુ રહે પંક્તિના રચયિતા કોણ છે ? - **રામપ્રસાદ બિસ્મિલ**

925. પ્રાચીન સમયમાં કલ્પસૂત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા ? - **આચાર્ય**

926. ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો .... નામનો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે. - **સામવેદ**

927. ચંદ્રગુપ્ત બીજા દ્વારા ક્યા શહેરને અગત્યનો દરજ્જો આપવામાં આવેલો હતો ? - ઉજ્જૈન

928. સન 1855ના ડિસેમ્બરની 28મી તારીખે બપોરે મુંબઈની એક ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં કોંગ્રેસની સૌપ્રથમ સભા મળી અને આ સભાથી કોંગ્રેસનો જન્મ થયો. કોંગ્રેસના આ પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? - **વ્યોમેશચંદ્ર બેનરજી**

929. ક્યા મહાનુભાવના પ્રયત્નોથી અંગ્રેજ સરકારે લગ્ન માટેની પુખ્ત વય ઠરાવતો કાયદો પસાર કર્યો હતો ? - **બહેરામજી મલબારી**

930. પશ્ચિમના વિદ્વાનો ઉપનિષદને ક્યા પ્રકારની વિદ્યા તરીકે ઓળખાવે છે ? - **ગૂઢ વિદ્યા**

931. આર્યોની પ્રાચીન સંસ્થા ક્યા નામે જાણીતી હતી ? - **વિદથ**

932. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ'ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું. 'કરન્ટ થોટ'ના લેખકનું નામ જણાવો. - **વાલજી ગોવિંદજી દેસાઈ**

933. સિંધુ સંસ્કૃતિના લોકો ક્યા દેવની પૂજા કરતા હતા ? - **પશુપતિ**

934. પ્રાચીન સ્થળ કાલીબંગા ક્યા રાજ્યમાં આવેલું છે ? - **રાજસ્થાન**

935. ભારતમાં પંચાયતોનું અસ્તિત્વ ક્યા સમયથી હતું ? - **વૈદિક**

936. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે થઈ હતી ? - **ફેબ્રુઆરી, 1937**

937. વિવિધ પ્રકારના સુંદર અને કલાત્મક સિક્કાઓ પ્રચલિત કરવાનું બહુમાન ભારતના ક્યા રાજાને ફાળે જાય છે ? - **ચંદ્રગુપ્ત પહેલા**

938. જલિયાવાલાબાગ હત્યાકાંડને કારણે રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો ક્યો ખિતાબ સરકારને પરત કરેલ ? - **નાઈટહુડ**

939. જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો પૈકીના ઓગણીસમાં તીર્થંકર મલ્લિનાથનું પ્રતિક (લાંછન) ક્યું ? - **કળશ**

940. દિલ્હીમાં સૌપ્રથમ અફઘાન રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? - **બહલોલ લોદી**

941. રાષ્ટ્રીય પંચાગનો પહેલો મહિનો ક્યો હોય છે ? - **ચૈત્ર**

942. 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? - **ચંદબરદાઈ**

943. ક્યા મુઘલ શાસકે પાણીપત અને અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું ? - **બાબર**

944. ભક્તિ આંદોલન સમયે મીરાંબાઈ ક્યા રાજ્યમાં હતા ? - **રાજસ્થાન**

945. મુઘલ બાદશાહ અકબરના પ્રતિરક્ષક તરીકે કોની નિમણૂક કરાઈ હતી ? - **બૈરમખાન**

946. જૈન ધર્મના ત્રણ રત્નો ક્યા છે ? - **દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય**

947. ક્યા બહમની શાસકે બીજાપુરમાં ગોળગુંબજનું નિર્માણ કરાવ્યું હતું ? - **આદિલશાહ**

948. ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યા બંધાવ્યો હતો ? - **ઔરંગાબાદ**

949. પ્રાચીન સ્થળ બાનાવલી ક્યા રાજ્યમાં આવેલું છે ? - **હરિયાણા**

950. મધ્યયુગીન ભારત સંદર્ભે તકાવી એટલે... - **કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ઋણ**

951. દિલ્હીના ક્યા સુલતાને પિરામનના રાજપૂત સરદાર મોખરાજી ગોહિલને હરાવ્યા હતા ? - **મુહમ્મદ બિન તુઘલક**

952. રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પસાર થયો તે સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ? - **લોર્ડ નોર્થ**

953. અલાહાબાદ પ્રશસ્તિમાં ક્યા શાસકની સો યુદ્ધોની ગાથા છે ? - **સમુદ્રગુપ્ત**

954. પ્રાચીન ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખાય છે ? - **સમુદ્રગુપ્ત**

955. પૃથ્વીરાજ ચૌહાણે તરાઈનના પ્રથમ યુદ્ધમાં કોને પરાજય આપ્યો હતો ? - **મહંમદ ઘોરી**

956. બિહારના સાસારામમાં ક્યા શાસકનો મકબરો આવેલો છે ? - **શેરશાહ સુરી**

957. ભક્તિ આંદોલનના સંત રામાનંદ દક્ષિણ ભારતથી આવીને ક્યા સ્થાયી થયા હતા ? - **બનારસ**

958. ધ ટ્રસ્ટ ઓફ ડેસ્ટિની ભાષણ સાથે સંકળાયેલ રાષ્ટ્રવાદી નેતા કોણ છે ? - **જવાહરલાલ નેહરુ**

959. કઈ તારીખે વડાપ્રધાન એટલીએ હિંદ સ્વાતંત્રનો પ્રસ્તાવ આમસભા સમક્ષ રજૂ કરેલો - **4 જુલાઈ, 1947**

960. રોલેટ એક્ટ......... તરીકે પણ જાણીતો છે. - **અરાજકતાવાદી અને ક્રાંતિકારી અપરાધ અધિનિયમ**

961. ભારતની સ્વાતંત્ર્ય ચળવળના આંતરવિગ્રહ બળવાના બે પ્રખ્યાત નેતાઓ સિંધુ અને કાન્હ ક્યા સમુદાયના હતા ? - **સંથાલ**

962. કેવલાદ્વૈત સાથે ક્યા મહાનુભાવ જોડાયેલા છે ? - **શંકરાચાર્ય**

963. 'અભિનવ ભારત સમિતિ'નું નામ પહેલા.......હતું. - **મિત્ર મેલા**

964. દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો. - **ઔરંગઝેબ**

965. સિકંદર અને પોરસ લોકો વચ્ચે ક્યું યુદ્ધ થયું હતું ? - **ઝેલમનું યુદ્ધ**

966. મોતીલાલ નેહરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો તે કાયદો ક્યો હતો ? - **રોલેટ એક્ટ, 1919**

967. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. - **જીવરાજ નારાયણ મહેતા**

968. નિઘન્ટુ ગ્રંથની રચના ક્યા આયુર્વેદાચાર્યએ કરી હતી ? - **ધન્વંતરી**

969. ક્યા સંત તિરુપતિ બાલાજીને વૈષ્ણવ ધર્મનું કેન્દ્ર બનાવ્યું હતું ? - **રામાનુજાચાર્ય**

970. મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરે ચંદેરીના યુદ્ધમાં ક્યા શાસકને પરાજય આપ્યો હતો ? - **મેદનીરાય**

971. પ્રાચીન ભારતીય ઈતિહાસમાં દાનવીર અને શિલાદિત્ય તરીકે ક્યા શાસક જાણીતા છે ? - **હર્ષવર્ધન**

972. દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે 'તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે' એમ ભારપૂર્વક કોણે કહ્યું ? - **ગોખલે**

973. મુંબઈ યાન નામની પદ્યશૈલીની શરૂઆત ક્યા શાસકે કરાવી હતી ? - **બાબર**

974. ક્યા ચાર્ટર એક્ટ દ્વારા સિવિલ સર્વિસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનો નિર્ણય થયો ? - **1853**

975. ક્યા ગવર્નરે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં કાયમી જમાબંધી લાગુ કરી હતી ? - **કોર્નવોલિસ**

976. ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી, 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? - **સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)**

977. વિશિષ્ટાદ્વૈત સાથે કોણ જોડાયેલું છે ? - **રામાનુજાચાર્ય**

978. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? - **અકબર અને હેમુ**

979. લંડન ઈન્ડિયન સોસાયટી તથા ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? - **દાદાભાઈ નવરોજી**

980. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા ? - **રાજા રામમોહનરાય**

981. શુંગ વંશનો ઉદય ક્યા વંશના રાજવીઓના પતન બાદ થયેલ હતો ? - **મૌર્ય વંશ**

982. ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલ હતી ? - **પાટલીપુત્ર**

983. અલાહાબાદ પ્રશસ્તિ ક્યા કોતરાયેલો છે ? - **અશોક સ્તંભ પર**

984. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર ક્યા કમિશને જલિયાવાલા બાગના હત્યાકાંડ અંગે જનરલ ડાયરનો બચાવ કર્યો હતો ? - **હંટર કમિશન**

985. શ્રીકંઠ ક્યા વાદ સાથે સંકળાયેલા છે ? - **શિવાદ્વૈત**

986. કઈ જગ્યાએ યોજાયેલી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સભામાં મોહનદાસ કે. ગાંધીએ હાજરી આપી હતી ? - **કલકત્તા**

987. ક્યા અધિવેશનમાં પ્રથમ વખત વંદેમાતરમ ગવાયું હતું ? - **1896**

988. ભક્તિ આંદોલન દરમિયાન નામદેવ ક્યા વિસ્તારમાં કાર્યરત હતા ? - **મહારાષ્ટ્ર**

989. 'સિદ્ધાંત શિરોમણિ' ગ્રંથના રચયિતા કોણ ? - **ભાસ્કરાચાર્ય**

990. પ્રાચીન ભારતીય ઈતિહાસમાં અંતિમ મહાન સમ્રાટ તરીકે કોને ઓળખાય છે ? - **હર્ષવર્ધન**

991. કબીર ક્યા સુલતાનની સમકાલીન હતા ? - **સિકંદર લોદી**

992. ક્યા સૂફી સંતને ગરીબ નવાઝ તરીકે ઓળખાય છે ? - **શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી**

993. 'રાણી પદ્માવતી' ભારતના મધ્યકાલીન યુગના ક્યા રાજ્યની હતી ? - **ચિત્તોડનું રાજ્ય**

994. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? - **23 જૂન, 1757**

995. જોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા ? - **સાત**

996. ભારતના ચંદ્રનગર, મહી, કરાઈકલ અને પોંડિચેરી જેવા પ્રદેશો પર કઈ યુરોપિયન પ્રજાનું આધિપત્ય હતું ? - **ફ્રેન્ચ**

997. ઈજીપ્તના રાજા ટોલ્મી-II ફિલાડેલ્ફસ દ્વારા બિંદુસારના દરબારમાં મોકલાયેલા રાજદૂતનું નામ.............હતું.- **ડાયનાઈસીઅસ**

998. 'પાઈકા વિદ્રોહ'........માં થયો હતો. - **ઓરિસ્સા**

999. ન્યાયદર્શન કોના દ્વારા રચિત છે ? - **ગૌતમ**

1000. ક્યા ક્રાંતિકારીએ પોલીસના હાથે ન પકડાવા આલ્ફ્રેડ પાર્કમાં આત્મહત્યા કરી હતી ? - **ચંદ્રશેખર આઝાદ**

1001. ક્યા રાષ્ટ્રવાદી નેતા 'ધ ટ્રસ્ટ ઓફ ડેસ્ટીની'ના ભાષણ સાથે સંકળાયેલ છે ? - **જવાહરલાલ નેહરુ**

1002. દયાનંદ સરસ્વતીએ બચાવના સ્થાને કઈ નીતિ અપનાવી હતી ? - **પ્રહાર**

1003. ક્યા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સિતારમૈયાને હરાવીને અધ્યક્ષ બનેલા ? - **1939**

1004. જલિયાવાલાબાગ હત્યાકાંડની તપાસ કરનાર ક્યા કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો હતો ? - **હન્ટર કમિશન**

1005. કોણે 'ઓશિયનીક સર્કલ'નો વિચાર ઘડ્યો ? - **મહાત્મા ગાંધી**

1006. સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી પંજાબ કેસરી તરીકે ઓળખાતા ક્યા વ્યક્તિનું મૃત્યુ થયું ? - **લાલા લજપતરાય**

1007. ઈ.સ.1773માં કોના દ્વારા જમીન મહેસૂલ ઉઘરાવવા માટે હરાજી પદ્ધતિ શરૂ કરવામાં આવી ? - **વોરન હેસ્ટિંગ્સ**

1008. ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કોની સાથે થયા હતા ? - **કુમારદેવી**

1009. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનનો ઉદેશ શું હતો ? - **માનવસેવા એ જ પ્રભુસેવા**

1010. ચિનાબ નદીનું પૌરાણિક નામ જણાવો. - **અસ્કિની**

1011. ભારતના પ્રાચીન ગણરાજ્યોમાં લિચ્છવીઓનું ગણરાજ્ય એટલે ક્યું ? - **વૈશાલી**

1012. રાષ્ટ્રીય કટોકટીના જાહેરનામાની અસર પૈકી સંઘ સરકારની કારોબારી સત્તાઓનું ? - **વિસ્તરણ થાય**

1013. ઈલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકૂટ રાજા.........એ બંધાવ્યું હતું. - **ક્રિષ્ના-I**

1014. ઝાંસીમાં સિપાહીઓને તેમના અધિકારીઓની અવગણના કરવા તેમજ હિંસા અને હત્યા માટે કોણે પ્રેર્યા ? - **લછમણ રાવ**

1015. બૌદ્ધ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ચાર ઉમદા સત્યો દ્વારા રજૂ થાય છે. કયું ઉમદા સત્ય છે ? - **દુ:ખ, દુ:ખનું કારણ અને દુ:ખની સમાપ્તિ**

1016. સિંધુ સભ્યતાનું આલમગીરપુર મથક ક્યા આવેલ છે ? - **ઉત્તર પ્રદેશ**

1017. ભક્તિ આંદોલન દરમિયાન રામાનંદ ક્યા વિસ્તારમાં હતા ? - **વારાણસી**

1018. 1930નો શારદા અધિનિયમ.........તરફ દિશામાન કરે છે. - **છોકરાઓ અને છોકરીઓ બંને માટે લગ્ન વયનું નિયમન**

1019. કઈ હસ્તપ્રત પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર બાબતે વૃત્તાંત આપે છે ? - **બખ્શાલી હસ્તપ્રત**

1020. ક્યા રેલવે જંક્શનનું પુનઃ નામકરણ દિનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન તરીકે થયું ? - **મુગલસરાઈ, ઉત્તર પ્રદેશ**

1021. ક્યા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા ? - **સુરત**

1022. મહાત્મા ગાંધીએ કઈ દરખાસ્તને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી હતી ? - **ક્રિપ્સ મિશનની દરખાસ્ત**

1023. યોગદર્શનના રચયિતા કોણ છે? - **પતંજલિ**

1024. ....ના સમયગાળા દરમિયાન કેન્દ્રીય સભામાં ઈલબર્ટ બીલ રજૂ કરવામાં આવ્યું. - **લોર્ડ રિપન**

1025. ક્યા ગવર્નર જનરલે પ્રાદેશિક ભાષાની મુશ્કેલી દૂર કરવા ભારતીયોને ઉત્તરદાયી પદ પર નિમ્યા ? - **વિલિયમ બેન્ટિક**

1026. બંગાળીમાં સંવાદ કૌમુદી કોણ ચલાવતું હતું ? - **રાજા રામમોહન રાય**

1027. ક્યો મુઘલ બાદશાહ સપ્તાહના સાતેય દિવસ અલગ રંગના કપડા પહેરતો ? - **હુમાયુ**

1028. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ઈંગ્લેન્ડમાં ક્યો પક્ષ સત્તા પર હતો ? - **લેબર પાર્ટી-મજૂર પક્ષ**

1029. ક્યો મુઘલ બાદશાહ ટોપીઓ સીવી કુરાનની આયાતો લખી પોતાનું ગુજરાન ચલાવતો ? - **ઔરંગઝેબ**

1030. ક્યુ રોમેન્ટિક નાટક પુશ્યભૂતિ રાજવી હર્ષ દ્વારા લખાયેલું છે? - **રત્નાવલી**

1031. વાંડીવંશની લડાઈ 1760માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ? - **જનરલ આયર કુફ**

1032. તક્ષશિલા યુનિવર્સિટી ક્યા ધર્મના અભ્યાસનું અગત્યનું કેન્દ્ર હતું ? - **બૌદ્ધ ધર્મ**

1033. બીજી બૌદ્ધ પરિષદ.......... સ્થળે યોજાઈ હતી. - **વૈશાલી**

1034. તત્વબોધિની સભાની સ્થાપના કોણે કરી હતી ? - **દેવેન્દ્રનાથ ટાગોર**

1035. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ દાંડી સત્યાગ્રહના સમય દરમિયાન ભારતના વાઈસરોય કોણ હતા ? - **લોર્ડ ઈરવીન**

1036. ખાનવીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? - **બાબર અને રાણાસાંગા**

1037. 1920ના ક્યા અધિવેશનમાં કોંગ્રેસના બંધારણમાં પરિવર્તન થયું ? - **નાગપુર અધિવેશન**

1038. મહેસૂલ વસુલાત માટે ક્યા ગવર્નરે દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરી હતી ? - **વોરનહેસ્ટિંગ્સ**

1039. લોર્ડ વેલેસ્લીએ સૌપ્રથમ ક્યા શાસક પાસે સહાયકારી યોજનાનો સ્વીકાર કરાવ્યો ? - **હૈદરાબાદના નિઝામ**

1040. બાળ વિવાહ જેવી કુપ્રથાઓમાં સુધારાઓનું કાર્ય કોણે કરેલું છે ? - **રાજા રામમોહન રાય**

1041. પશ્ચિમ ભારતમાં ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત-II દ્વારા તેના સિક્કા માટે કઈ ધાતુ પસંદ કરવામાં આવી હતી ? - **ચાંદી**

1042. આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ ઉપર ચલાવવામાં આવેલા રાજદ્રોહના કેસમાં ફોજ વતી કોણ લડયા હતા ? - **ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નેહરુ**

1043. ભારતમાંથી સતિ પ્રથા નાબૂદ કરવાની ચળવળ કોણે ચલાવી હતી ?- **રાજા રામમોહન રાય**

1044. ક્યા સુલતાને તેના દરબારમાં સઝદા પ્રથા શરૂ કરાવી હતી ? - **ગ્યાસુદ્દીન બલબન**

1045. ક્યા શાસનકાળને તેલુગુ સાહિત્યના ક્લાસીક યુગ તરીકે ઓળખવામાં આવે છે ? - **કૃષ્ણદેવરાય**

1046. 1857ના બળવા દરમિયાન ક્યા ભારતીય રાજ્યો બ્રિટિશને વફાદાર રહ્યા ? - **ગ્વાલિયર, હૈદરાબાદ, બરોડા, પટિયાલા**

1047. દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતો ? - **ફિરોઝશાહ**

1048. રાષ્ટ્રીય કટોકટીના જાહેરનામાની અસર પૈકી સંસદની કાયદો ઘડવાની સત્તાઓનું ? - **વિસ્તરણ થાય**

1049. દ્વૈતાદ્વૈતવાદ સાથે કોણ જોડાયેલું છે ? - **નિમ્બાર્કાચાર્ય**

1050. એની બેસન્ટનું નામ કઈ ચળવળ સાથે જોડાયેલું છે ? - **હોમરૂલ ચળવળ**

1051. ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ? - **સામવેદ**

1052. ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુંડલ સમિતિની નિમણૂક ક્યા વર્ષમાં થઈ હતી ? - **1906**

1053. 1930માં મુસ્લિમ લીગના પ્રમુખ કોણ હતા ? - **સર મુહમ્મદ ઈકબાલ**

1054. ગવર્નર જનરલ લિટનના ક્યા કાયદાને ધ ગેગિંગ એક્ટ, ગુંગળાવનારા ધારા તરીકે દેશભરમાં વખોડી કાઢવામાં આવ્યો? - **ધ વર્નાક્યુલર પ્રેસ એક્ટ, 1878**

1055. રામ રાજા દ્વારા લખાયેલ 'એસેઝ ઓફ ધી આર્કિટેક્ચર ઓફ ધ હિન્દુઝ'નું પ્રકાશન ક્યારે થયું હતું ? - **1834**

1056. અમૃતસરમાં સુવર્ણ મંદિર બંધાવનાર ગુરુ કોણ હતા ? - **ગુરુ અર્જુનદેવ**

1057. ગેરીલા યુદ્ધ પદ્ધતિ માટે કોણ જાણીતું છે ? - **શિવાજી**

1058. ચીની મુસાફર ફાહિયાને ક્યા શાસકના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી ? - **ચંદ્રગુપ્ત બીજો**

1059. 'તાજ-ઉલ-ઈકબાલ તારીખ ભોપાલ' કોની આત્મકથા છે ? - **શાહજહાં બેગમ**

1060. માનવ ધર્મ સભાના સ્થાપક કોણ છે ? - **દુર્ગારામ મહેતા**

1061. અંતિમ મુગલ બહાદુરશાહ ઝફરને દેશનિકાલ કરી અંગ્રેજોએ ક્યા સ્થળે મોકલી દીધો હતો ? - **રંગૂન**

1062. અકબરનો શાસનકાળ કેટલો છે ? - **ઈ.સ.1556-1605**

1063. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતું ? - **જ્યોર્જ યુલ**

1064. ક્યા કેસ હેઠળ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ, 1931ના રોજ ફાંસી અપાઈ હતી ? - **લાહોર કાવતરા કેસ**

1065. મહર્ષિ પાણિનીએ ક્યા ગ્રંથની રચના કરી ? - **અષ્ટાધ્યાયી**

1066. મુઘલ સલ્તનત દરમિયાન હુમાયુના પુત્ર અકબરનો શાસનકાળ શેનો સુવર્ણકાળ કહેવાય છે ? - **હિન્દી સાહિત્યનો સુવર્ણકાળ**

1067. દેવ સમાજના સ્થાપક કોણ છે ? - **શિવનારાયણ અગ્નિહોત્રી**

1068. ભારતમાં ગુપ્તયુગ દરમિયાન ક્યા શાસકના સમયમાં હૂણોનું આક્રમણ થયું ? - **કુમારગુપ્ત પ્રથમ**

1069. ડેલહાઉસીની ખાલસા નીતિ હેઠળ કરજની ઉઘરાણી તળે કોણ ખાલસા થયેલ હતું ? - **વરાડ પ્રાંત**

1070. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે 1857ના વિપ્લવની શરૂઆત ક્યા સ્થળેથી થઈ હતી ? - **મેરઠ**

1071. બાબરને આગ્રામાં દફનાવ્યા બાદ ફરી ક્યા દફનાવવામાં આવ્યો ? - **કાબુલ**

1072. રાજા રામમોહન રાયના અવસાન પછી બ્રહ્મોસમાજની આગેવાની કોણે લીધી હતી ? - **દેવેન્દ્રનાથ ટાગોર**

1073. તાનસેનનું મૂળ નામ શું હતું ? - **રામતનુ પાંડે**

1074. રાષ્ટ્રીય કટોકટીના જાહેરનામાની અસર સાથે બંધારણમાં ખાત્રીથી આપવામાં આવેલા મૂળભૂત હકોનું ? - **નિયંત્રણ થાય**

1075. સપ્તભાગીય ન્યાયનો સિદ્ધાંત ક્યા ધર્મ સાથે સંબંધિત છે ? - **જૈન ધર્મ**.

1076. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે હિંદી સચિવ કોણ હતા ? - **લોર્ડ ક્રાન્સ**

1077. ક્યા શાસકના સમયમાં પાટલીપુત્ર રાજધાની બની ? - **ઉદયન**

1078. 'હમારી માતૃભૂમિ સ્વતંત્રતા ચાહતી હૈ, તુમ મુઝે અપના ખૂન દો, ઔર મૈં તુમ્હે સ્વતંત્રતા દૂંગ' આ (લલકાર) કોણે કહ્યું હતું ? - **સુભાષચંદ્ર બોઝ**

1079. મેક્સમુલરના મતે આર્યોનું મૂળ વતન ક્યું હતું ? - **મધ્ય એશિયા**

1080. 1931ના કરાચી અધિવેશનમાં કોની અધ્યક્ષતા હેઠળ મૂળભૂત અધિકારોની માંગ થઈ ? - **વલ્લભભાઈ પટેલ**

1081. નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્વતંત્ર ભારતની સરકાર ક્યા સ્થાપી હતી ? - **સિંગાપુર**

1082. કબીર .... ભક્તિના સંત હતા. - **નિર્ગુણ**

1083. ટીપુ સુલતાન અન્ય ક્યા નામે જાણીતા હતા ? - **મૈસૂરના વાઘ**

1084. શ્યામજીકૃષ્ણ વર્માની યાદમાં ગુજરાતમાં એક સ્મારક બનાવેલ છે તે ક્યા નામે ઓળખાય છે ? - **ક્રાંતિ તીર્થ**

1085. 1916ના ક્યા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જહાલવાદી અને મવાળવાદી દળોનું જોડાણ થયું ? - **લખનઉ અધિવેશન**

1086. કોંગ્રેસે જલિયાવાલાબાગ હત્યાકાંડની તપાસ માટે કોની અધ્યક્ષતામાં પંચ રચ્યું હતું ? - **મદનમોહન માલવિય**

1087. બૌદ્ધ સંઘને કંદબવેણ વન ક્યા શાસકે ભેટમાં આપ્યું હતું ? - **બિંબિસાર**

1088. શ્રીમદ્ ભાગવત ગીતા અસલ કઈ ભાષામાં લખાઈ હતી ? - **સંસ્કૃત**

1089. 'ઈલ્બર્ટ બીલ'નો વિવાદ કોના સમયમાં સર્જાયો હતો ? - **લોર્ડ રિપન**

1090. 1942ના હિંદ છોડો આંદોલનને' ક્યા ગુપ્ત દસ્તાવેજ દ્વારા ચલાવાયું હતું ? - **આંધ્ર સરક્યુલર**

1091. આર્યો ક્યુ પીણું પીતા હતા ? - **સોમરસ**

1092. ખજૂરાહોના સુંદર મંદિરોનું નિર્માણ ક્યા રાજવીઓએ કરાવ્યું હતું ? - **ચંદેલ રાજવીઓએ**

1093. તુલસીદાસને કઈ ભક્તિના સંત મનાય છે ? - **સગુણ**

1094. સંઘમાં રહેવાવાળા બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો ક્યા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ? - **વિનય પિટક**

1095. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કેટલા પરગણાની જાગીર મળી હતી ? - **24**

1096. ભારતની આઝાદી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતું ? - **જે.બી.કૃપલાણી**

1097. ક્યા ગવર્નર જનરલે ભારતમાં બાળકીઓને દૂધપીતી કરવાનો રિવાજ દૂર કર્યો ? - **લોર્ડ હાર્ડિંગ**

1098. સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? - **સિસ્ટર નિવેદિતા**

1099. પુરંદરની સંધિ મહારાજા છત્રપતિ શિવાજી તથા મોગલ વચ્ચે કઈ સાલમાં થઈ હતી ? - **ઈ.સ.1665**

1100. ટીપુ સુલતાન ક્યા રાજ્યના સુલતાન હતા ? - **મૈસુર**

1101. પોર્ટુગીઝની રાજધાની તરીકે ગોવાને ક્યા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી ? - **ઈ.સ.1530**

1102. ગુરુ અર્જુને ક્યા ગ્રંથનું સંકલન કર્યું હતું ? - **આદિગ્રંથ/ગ્રંથસાહિબ**

1103. ભારતમાં આધુનિક ઢબનું ન્યાયતંત્ર ક્યા ગવર્નર જનરલે સ્થાપ્યું હતું ? - **લોર્ડ કોર્નવોલિસ**

1104. ચૌસાનું યુદ્ધ કોની વચ્ચે ખેલાયું હતું ? - **હુમાયું અને શેરખાન**

1105. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરેલ હતી ? - **જ્યોતિબા ફુલે**

1106. ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરાવનાર ગવર્નર કોણ હતા ? - **કોર્નવોલિસ**

1107. ક્યા ગવર્નર જનરલે લોકનિર્માણ વિભાગની સ્થાપના કરી હતી ? - **લોર્ડ ડેલહાઉસી**

1108. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગામડામાં આયોજિત પ્રથમ અધિવેશન ક્યું હતું ? - **ફૈજપુર**

1109. રાજા રામમોહન રાયના સહયોગથી ક્યા ગવર્નર જનરલે સતીપ્રથાના નિષેધનો અમલ કરાવ્યો ? - **લોર્ડ વિલિયમ બેન્ટિક**

1110. ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થાનાંતરિત કરવાના સમયે ભારતમાં ક્યા વાઈસરોય હતા ? - **લોર્ડ હાર્ડિંગ**

1111. ક્યા મુઘલ બાદશાહના પુત્ર દારાશિકોહે ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો ? - **શાહજહાં**

1112. મહાવીર સ્વામી કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ? - **અર્ધ માગધી**

1113. ભારતમાં પહેલીવહેલી વસતી ગણતરી ક્યા વાઈસરોયે અને કઈ સાલમાં કરાવી હતી ? - **લોર્ડ રિપન- ઈ.સ.1881**

1114. ગદર પાર્ટીના સ્થાપક કોણ હતા ? - **લાલા હરદયાળ**

1115. પોર્ટુગીઝ કંપની ભારતમાં ક્યા નામે ઓળખાતી હતી ? - **એસ્ટાડો-દા-ઈન્ડિયા**

1116. ચૌલ શાસકોએ ક્યા શહેરને રાજધાની બનાવી હતી ? - **તાંજોર**

1117. હૈદરાબાદમાં આવેલા ચાર મિનારનું નિર્માણ કોણે કરાવ્યું હતું? - **કુલી કુતુબશાહ**

1118. અમૃતસર શહેર કોણે વસાવ્યું હતું ? - **ગુરુ રામદાસ**

1119. કાલીબંગાન સ્થળેથી પ્રાચીન સમયના માટીના રમકડાંના અવશેષો મળી આવેલ છે. કાલીબંગાન ક્યા રાજ્યમાં આવેલ છે ? - **રાજસ્થાન**

1120. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? - **પોર્ટુગીઝ (ફિરંગી)**

1121. હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરોમાં મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો બે માળના અને પાંચથી સાત ઓરડાવાળા હતા, જ્યારે નીચલા વર્ગના લોકોના મકાનો એક માળના અને કેટલા ઓરડાવાળા હતા ? - **બેથી ત્રણ ઓરડાવાળા**

1122. બન્ચ ઓફ થોટ્સ પુસ્તકના લેખક કોણ છે ? : **એમ.એસ. ગોલવાલકર**

1123. એની બેસન્ટનું નામ કઈ સંસ્થા સાથે જોડાયેલું છે? : **થિયોસોફિકલ સોસાયટી**

1124. ઋગ્વેદમાં ક્યા દેવ માટે સૌથી વધુ **ઋચાઓ છે ? : ઈન્દ્ર**

1125. સ્વતંત્રતા પછી વિનોબા ભાવેએ ક્યું આંદોલન ચલાવ્યું ? : **ભૂદાન આંદોલન**

1126. મેઘસંદેશમ્‌માં કઈ બાબતનું વર્ણન છે ? - **રાજા કુબેરના વિષય ઉપર કાવ્ય**

1127. બાળગંગાધર ટિળકે ક્યા શહેરમાંથી હોમરુલ (1916)ની ચળવળ શરૂ કરી ? : **પુના**

1128. ત્રણ સમુદ્રોના પાણી પીનારાની ઉપમા કોને અપાય છે? : **શાતકર્ણી**

1129. મૌર્ય સમ્રાટ અશોકને બૌદ્ધ ધર્મની દિક્ષા કોણે આપી હતી ? - **નિગ્રોથ**

1130. ગૌતમી પુત્રશ્રી સાતકર્ણીની પ્રશંસામાં કોણે પ્રશસ્તિ લખી હતી? - **હરિષેણ**

1131. ઋતુસંહાર પુસ્તકમાં કઈ બાબતનું વર્ણન મળે છે ? - **મનુષ્ય અને કુદરતી બળો વચ્ચે સુમેળભર્યા સંબંધોની**

1132. ઉત્તર ભારતમાં વૈષ્ણવ ભક્તિની રામશાખાના સ્થાપક કોણ હતા ? - **રામાનંદ**

1133. ક્યા કરાર સંદર્ભે વંચિત વર્ગો માટે અલગ મતદારમંડળનો વિચાર પડતો મૂકાયો ? - **પુના કરાર**

1134. કેબિનેટ મિશન યોજના સાથે ક્યું વર્ષ જોડાયેલ છે ?. - **ઈ.સ.1946**

1135. ફતેહપુર સિક્રી નગરની સ્થાપના **કોણે કરી હતી ? - અકબર**

1136. ક્યા વર્ષના દિલ્હી અધિવેશનમાં કોંગ્રેસનું બીજું વિભાજન થયું? - **1918**

1137. ક્યા શાસનકાળને મુઘલાઈ સુવર્ણયુગ તરીકે ગણનામાં લેવાય છે ? - **શાહજહાં**

1138. આઝાદ હિંદ ફોજનું વડુમથક સિંગાપુરથી ફેરવી ક્યા ખસેડાયું હતું ? - **રંગુન**

1139. હિસાર કોણે વસાવ્યું હતું ? - **ફિરોજશાહ તઘલખ**

1140. ભારતમાં ક્યા ગવર્નરે અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા સ્થાપી હતી ? - **કોર્નવોલિસ**

1141. મનુષ્યના નિધન સમયે ક્યા પુરાણનું વાંચન થાય છે ? - **ગરુડ પુરાણ**

1142. ભક્તિ આંદોલન દરમિયાન ચૈતન્ય ક્યા રાજ્યમાં હતા ? - **ઓરિસ્સા**

1143. ક્યા અધિવેશનથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જહાલવાદી અને મવાળવાદી એમ બે દળ પડી ગયા ? - **1907ના સુરત અધિવેશન**

1144. ચિત્રકલાનો સુવર્ણકાળ ક્યા શાસનકાળને મનાય છે ? - **જહાંગીર**

1145. કર્ણભાર નાટકના રચયિતા કોણ છે ? - **મહાકવિ ભાસ**

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.
A) અંકિયા નટ B) નાધિયા C) કીક્કલી D) મુંઝરા

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

2. 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ?
A) ઉજ્જૈન B) ગયા C) પ્રયાગ D) અયોધ્યા

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

3. 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ'- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?
A) કઠોપનિષદ B) ભગવત ગીતા
C) મહાભારત D) રામાયણ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

4. ઈ.સ.1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યુ હતું ?
A) મહાત્મા ગાંધી B) રામકૃષ્ણ પરમહંસ
C) સ્વામી વિવેકાનંદ D) દયાનંદ સરસ્વતી

5. રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?
A) વાગભટ્ટ B) વરાહમિહિર C) વાત્સ્યાયન D) બ્રહ્મગુપ્ત

GPSC પેપર - 1 - 2017

6. નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ?
A) તોડી B) દરબારી C) મલ્હાર D) ભોપાલી

7. નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ?
A) સારંગદેવ B) અબોબલ C) ભરતમુની D) માતંગ

8. 'સતિપતિ સંપ્રદાય' એ ક્યા રાજ્યનો આદિવાસી સમુદાય છે ?
A) હિમાચલ પ્રદેશ B) ગુજરાત
C) કર્ણાટક D) ઓરિસ્સા

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

9. ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી ક્યો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી દર્શાવે છે ?
A) નાગર B) વેસર C) દ્રવિડ D) ચૈત્ય

10. નીચેના પૈકી ક્યું સંસ્કૃત મહાકાવ્ય નથી ?
A) મેઘદૂત B) શિશુપાલ વધ
C) કિરાતાર્જુનિયમ D) કુમારસંભવ

11. વલ્લમકલી (Vallamkali)નો ઉત્સવ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
A) તમિલનાડુ B) આંધ્ર પ્રદેશ C) કેરાલા D) કર્ણાટક

12. ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?
A) ઝારખંડ B) હિમાચલ પ્રદેશ C) ઉત્તરાખંડ D) છત્તીસગઢ

13. પન્નાલાલ ઘોષ ક્યા વાદ્યવાદક હતા ?
A) વાયોલિન B) વાંસળી C) સિતાર D) તબલા

PSI GK - 1/1/2017

14. 'મોહિની અટ્ટમ' ક્યા રાજ્યનું નૃત્ય છે ?
A) કેરળ B) તમિલનાડુ C) કર્ણાટક D) ઓડિશા

PSI GK - 4-3/5-3/2017

15. નીચેનમાંથી ક્યું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે ?
A) સાંચી B) ખજૂરાહો C) માંડુ D) છત્રી

કોન્સ્ટેબલ - 23/10/2016

16. નૃત્યના દેવાધિદેવ કોણ હતા ?
A) નટરાજ B) નારદ C) વિષ્ણુ D) બ્રહ્મા

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

17. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?
A) રવિશંકર મહારાજ B) મોહનદાસ કરમચંદ ગાંધી
C) સરદાર વલ્લભભાઈ પટેલ D) મહાદેવ દેસાઈ

1)C, 2)D, 3)A, 4)C, 5)A, 6)A, 7)C, 8)B, 9)D, 10)A, 11)C, 12)B, 13)B, 14)A, 15)A, 16)A, 17)C.

GPSC પ્રિલિમ - 2001

18. "લજ્જા"ની લેખિકા કોણ?
A)શોભા ડે B)અરુંધતી રોય
C)તસ્લિમા નસરીન D)કિરણ બેદી

GPSC પ્રિલિમ - 2007

19. 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ?
A)આર.કે. નારાયણ B)વિક્રમ શેઠ
C)સલમાન રશદી D)વી.એસ. નાયપોલ
20. મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે?
A)અજમદઅલી ખાન B)શિવકુમાર શર્મા
C)સુલતાન ખાન D)વિશ્વમોહન ભટ્ટ
21. તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?
A)તમિલનાડુ B)કર્ણાટક C)કેરળ D)આંધ્ર
22. પંચમઢી ક્યા રાજ્યનું હિલ સ્ટેશન છે?
A)રાજસ્થાન B)મધ્યપ્રદેશ C)ઉત્તરપ્રદેશ D)બિહાર
23. ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?
A)અમેરિકા B)ભારત C)ચીન D)ઈંગ્લેન્ડ
24. બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે?
A)બંગાળ B)આસામ C)બિહાર D)ઓરિસ્સા
25. 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ?
A)રાધાકૃષ્ણન B)જવાહરલાલ નહેરુ
C)વિનોબા ભાવે D)ગોવિંદ વલ્લભ પંત

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

26. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે?
A)ભરત નાટ્યમ્ B) કથ્થક C) મણીપુરી D)કુચીપુડી
27. નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે?
A)અજંતા B)શિવાલિક C)એલિફંટા D)કોણાર્ક

PSI/ASI GK - 2/5/2015

28. અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે?
A)ઈસ્લામ ધર્મ B)બૌદ્ધ ધર્મ
C)શૈવ ધર્મ D)જૈન ધર્મ
29. "રૂસ્તમે હિન્દ"નું બિરૂદ કોને મળ્યું હતું?
A)અભિનવ બિન્દ્રા B)સુશીલકુમાર
C)દારાસિંહ D)યોગેશ્વર દત્ત

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

30. કલા પ્રકાર અને સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) લાલ રંગની મીનાકારી A)હૈદ્રાબાદ
2) ગુલાબી રંગની મીનાકારી B)સુરત
3) કાળા રંગની મીનાકારી C)જયપુર
4) જરદોશીકામ D)વારાણસી
A) 1-C, 2-D, 3-A, 4-B B) 1-D, 2-A, 3-B, 4-C
C) 1-A, 2-B, 3-C, 4-D D) 1-B, 2-C, 3-D, 4-A
31. નાટ્યપ્રકાર અને તેનું ઉદ્દભવસ્થાન અથવા તેના વિસ્તાર યોગ્ય રીતે ગોઠવો.
1) ભરત નાટ્યમ્ A) તામિલનાડુ
2) કૂચીપૂડી B)આંધ્ર
3) કથકલી C)કેરળ
4) લાવણી D)મહારાષ્ટ્ર
A) 1-B, 2-C, 3-D, 4-A B) 1-A, 2-B, 3-C, 4-D
C) 1-C, 2-D, 3-A, 4-B D) 1-D, 2-C, 3-A, 4-B

GPSC Class - 2 - 18/12/2016

32. સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે?
A)કેરલ B) કર્ણાટક
C)તામિલનાડુ D)ઉપરોક્ત એક પણ નહી
33. 'હોરમુઝ' બંદર ક્યા ધર્મ સાથે સંકળાયેલ છે?
A)ખ્રિસ્તી B)પારસી
C)યહુદી D)ઉપરોક્ત એકપણ નહી
34. ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌ પ્રથમ ક્યા રાજ્યમાં ફેલાયો હતો?
A)કેરલ B)ગોવા
C)તમિલનાડુ D)ઉપરોક્ત એક પણ નહી
35. 'ઘુમ્મર' ક્યા રાજયનું લોકનૃત્ય છે?
A)ઉત્તરપ્રદેશ B)રાજસ્થાન C)હરિયાણા D)મધ્યપ્રદેશ
36. મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે?
A)હાજી અલી શાહ ઓલિયા
B)હાજી અલી શાહ બુખારી
C)હાજી અલી નિઝામુદ્દિન ઓલીયા
D)ઉપરોક્ત એક પણ નહી

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

37. પોંગલ ક્યા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
A)કર્ણાટક B)કેરલ C)તામિલનાડુ D)આંધ્રપ્રદેશ

18)C, 19)C, 20)D, 21)D, 22)B, 23)B, 24)B, 25)B, 26)B, 27)A, 28)B, 29)C, 30)A, 31)B, 32)A, 33)B, 34)A, 35)B, 36)B, 37)C.

GPSC Class - 2 - 28/1/2017

38. સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓને યોગ્ય રીતે ગોઠવો.

1) દયાનંદ સરસ્વતી	A) પંચમહાલ ભીલ સેવામંડળ
2) પારસી સમાજ	B) સત્યશોધક સમાજ
3) ઠક્કર બાપા	C) આર્ય સમાજ
4) જ્યોતિબા ફૂલે	D) રહનુમા-ઈ-મઝદયસ્નન

A) 1-C, 2-D, 3-A, 4-B B) 1-A, 2-B, 3-C, 4-D
C) 1-B, 2-C, 3-D, 4-A D) 1-C, 2-D, 3-B, 4-A

GPSC Class-1 - 15/01/2017

39. નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી?
A) પોંગલ-તામિલનાડુ B) ગણગોર-બિહાર
C) ઓનમ-કેરલ D) બિહુ-આસામ

40. આપણાં પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરવામાં આવી?
A) ઈ.સ.1952 B) ઈ.સ.1956 C) ઈ.સ.1972 D) ઈ.સ.1962

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

41. સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ?
A) ખારી બોલી B) મૈથિલી C) અવધ D) વ્રજ

GPSC Class - 2 - 16/04/2017

42. ચીકનકારી (Chikan Embroidery) ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે?
A) લખનઉ B) હૈદરાબાદ C) જયપુર D) મૈસુર

43. "એ પેશન ફોર ડાન્સ" (A passion for dance) ના લેખક કોણ છે?
A) યામીની કૃષ્ણમુર્તિ અને રેણુકા ખાંડેકર
B) ડૉ. પુષ્પા સુબ્રમણ્યમ
C) સોનલ માનસિંહ D) રૂકમણી દેવી

44. નીચેના પૈકી કયો મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી?
A) શ્રી જેમીની રોય B) શ્રી મનજીત બાવા
C) શ્રી કે.એ. સાયગલ D) શ્રી રવિશંકર રાવલ

45. પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે?
A) વિણા B) સરોદ C) વાયોલિન D) સિતાર

46. સંગીતના વાદ્ય અને સંગીતના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી?
A) વાંસળી - પંડિત હરિપ્રસાદ B) શહેનાઈ- બિસમિલ્લા ખાન
C) સિતાર - પંડીત રવિશંકર D) સારંગી - અલી અમઝદ હુસેન

47. ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ કયાં આવેલ છે?
A) ચમોલી જિલ્લો B) નૈનિતાલ જિલ્લો
C) હરદ્વારા જિલ્લો D) અલમોડા જિલ્લો

48. પંડિત રવિશંકર કયા વાદ્ય (Musical Instrument) સાથે જોડાયેલ છે?
A) ગીટાર B) સરોદ C) સિતાર D) તબલા

49. નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે?
A) દુર્ગા ખોટે B) આશા ભોસલે
C) કિશોર કુમાર D) લતા મંગેશકર

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

50. 'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ?
A) ઉત્તર પ્રદેશ B) રાજસ્થાન C) મધ્ય પ્રદેશ D) બિહાર

51. 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ?
A) નવી દિલ્હી B) ચેન્નાઈ C) મુંબઈ D) કોલકાતા

52. નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે?
A) ઓનમ B) રંગાલી બીહુ C) નવરાત્રી D) પોંગલ

53. શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
A) ચલચીત્ર ડિરેક્ટર B) વ્યંગ ચિત્ર બનાવનાર
C) વાદ્ય સંગીત D) નૃત્ય

54. વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ?
A) માય ગોડ ડાઈડ યંગ B) ઈસ્લામીક બોમ્બ
C) લુક બેક ઈન એંગર D) એ સુટેબલ બોય

GPSC Class - 2 - 18/03/2017

55. અગત્યના મેળા અને તેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો.

A) પુષ્કર મેળા	1) ઉત્તરપ્રદેશ
B) ભવનાથ	2) બિહાર
C) કુંભમેળો	3) ગુજરાત
D સોનીપુર મેળો	4) રાજસ્થાન

A) A-3, B-1, C-2, D-4 B) A-1, B-2, C-4, D-3
C) A-4, B-3, C-1, D-2 D) A-2, B-4, C-1, D-3

38)A, 39)B, 40)A, 41)D, 42)A, 43)A, 44)C, 45)B, 46)D, 47)D, 48)C, 49)D, 50)D, 51)A, 52)A, 53)B, 54)D, 55)C.

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

56. ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે?
A)નાટક B)નૃત્ય C)સંગીત D)ઉપરના તમામ

નાયબ ચિટનીશ - 02/06/2015

57. ક્યા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે?
A)મહાબલીપુરમ B) કાંચીપુરમ
C)તિરૂવનંતપુરમ D)મદુરાઈ

GPSC Class - 2 - 16/04/2017

58. નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી ?
A)ગીદ્દા ડાન્સ - પંજાબ B) મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ
C)કુચીપુડી ડાન્સ - આંધ્ર પ્રદેશ D)બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ

59. નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ?
A)અન ટુ ધ લાસ્ટ B) અલ-બલાદ
C)આકાશ D)કાબુલીવાલા

60. દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?
A)નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા B)સાહિત્ય અકાદમી
C)સંગીત નાટક અકાદમી D)લલિતકલા અકાદમી

61. કાલા ઘોડા આર્ટ ફેસ્ટીવલ ક્યા સ્થળે આયોજિત કરવામાં આવે છે?
A)વડોદરા B)પુણે C)મુંબઈ D)મૈસુર

62. નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે ?
1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન
3. રવિશંકર 4. શિવકુમાર શર્મા
A)1 અને 2 B)2 અને 3 C)3 અને 4 D)4 અને 1

GPSC Class - 2 - 02/04/2017

63. 'નોંગક્રેમ ડાન્સ'નો તહેવાર ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?
A)સિક્કિમ B)ત્રિપુરા C)મણિપુર D)મેઘાલય

64. આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ?
A)મધ્ય પ્રદેશ B)મણિપુર C)આસામ D)અરૂણાચલ પ્રદેશ

65. કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે?
A)51 B)101 C)131 D)151

66. લોહરી ક્યા મહિનામાં ઉજવાય છે ?
A)એપ્રિલ B)જાન્યુઆરી C)જુલાઈ D)સપ્ટેમ્બર

67. હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે?
A)ઠુમરી B)ગઝલ
C)ધ્રુપદ D)ઉપરના પૈકી એકપણ નહી

68. રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?
A)ઐપન- હિમાચલ પ્રદેશ B) કૌલ્લમ - તમિલનાડુ
C)મંડના - મધ્યપ્રદેશ D)રંગાવલી - કર્ણાટક

69. કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ?
A)નાટ્યકળા B)નૃત્યકળા C)યુદ્ધકળા D)ચિત્રકળા

70. ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થયેલ હતું ?
A)મહારાષ્ટ્ર B)ગોવા C)રાજસ્થાન D)હિમાચલ પ્રદેશ

GPSC Class - 2 - 12/02/2017

71. નીચેના પૈકી ક્યું કોનનું ઘરેણું નથી?
A)સોનિયો B)દેઢો C)ત્રીટી D)વેઢલા

72. ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે?
A)કથકલી B)ભરતનાટ્યમ
C)નાદન્ત D)કુચીપુડી

73. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?
A)આંધ્રપ્રદેશ-કુચીપુડી B)તામિલનાડુ-ભરતનાટ્યમ
C)મધ્યપ્રદેશ-કાલબેલિયા D)ઉત્તરપ્રદેશ-કથક

74. નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં ક્યો વિકલ્પ સાચો નથી?
A)લેટર્સ ફ્રોમ એશિયા - રવિન્દ્રનાથ ટાગોર
B)ભવાની મંદિર - અરવિંદ ઘોષ
C)પ્રીજન ડાયરી - જવાહરલાલ નહેરૂ
D)સોવિયત એશિયા - જવાહરલાલ નહેરૂ

GPSC Class - 1 - 09/04/2017

75. પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ?
A)ગેરુ B)લાપિઝ લઝૂલી
C)લાપિઝી લીલો D)લાપિઝ કઝૂલી

76. નીચે પૈકી ક્યું વાદ્ય તંતુવાદ્ય છે ?
A)પાવરી B)કાંસીજોડા C)સુરંદો D)રમઝોળ

56)D, 57)A, 58)D, 59)D, 60)C, 61)C, 62)A, 63)D, 64)A, 65)D, 66)B, 67)C, 68)A, 69)C, 70)B, 71)A, 72)C, 73)C, 74)C, 75)B, 76)C.

77. પંજાબનું "જંગલ" કઈ કળા / પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?
A) ગાયન B) નાટ્ય C) વાદન D) દશ્ય

78. પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ ક્યા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?
A) મણિપુર B) મિઝોરમ C) મેઘાલય D) નાગાલેન્ડ

GPSC Class - 2 - 04/03/2017

79. 'વિશાખા' નો તહેવાર ક્યા રાજ્યમાં ઉજવાય છે ?
A) કર્ણાટક B) પંજાબ C) મહારાષ્ટ્ર D) આંધ્રપ્રદેશ

80. વર્ષ 2016ના યુનેસ્કો દ્વારા ક્યા સ્થપતિ દ્વારા' નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ?
A) લુઈસ ખાન (Louis Khan) B) લે કાર્ટર (Le Carter)
C) લે કોર્બુઝીયર (Le Corbusier) D) નેકચંદ (Nekchand)

GPSC Class - 2 - 18/03/2017

81. "બનીઠની" કઈ કળાની એક શૈલી છે ?
A) ચિત્રકળા B) શિલ્પકળા
C) નૃત્યકળા D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

82. તાંજોરના મંદિરમાં ક્યા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ?
A) કથકલી B) ઓડિસી C) કથક D) ભરતનાટ્યમ

83. 'ધ હેંગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?
A) અરૂંધતી રોય B) સલમાન રશ્દી
C) મેધા પાટકર D) નારાયણ મૂર્તિ

GPSC Class - 2 - 5/3/2017

84. નીચેના પૈકી ક્યા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરેલ છે ?
A) સન ટેમ્પલ કોનાર્ક B) ફત્તેપુર સીક્રિ
C) જન્તર મંતર - જયપુર D) ઉપરોક્ત બધા જ સ્થળો

85. રાજા રવીવર્મા ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?
A) નૃત્ય B) ચિત્રકળા
C) વાદ્ય સંગીત D) કંઠ સંગીત

86. ગીદ્દા (Gidda) નૃત્ય ક્યા પ્રદેશનું નૃત્ય છે ?
A) હરીયાણા B) પંજાબ C) ઉત્તર પ્રદેશ D) ગુજરાત

GPSC Class - 2 - 11/12/2016

87. સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.

A) બિન્દુ સરોવર	1) તિબેટ
B) નારાયણ સરોવર	2) રાજસ્થાન રાજ્ય
C) પુષ્કર	3) કચ્છ જિલ્લો
D) માનસરોવર	4) ભુવનેશ્વર શહેર

A) A-4, B-3, C-2, D-1 B) A-3, B-4, C-1, D-2
C) A-2, B-3, C-4, D-1 D) A-1, B-2, C-3, D-4

GPSC Class - 2 - 05/02/2017

88. રાગિણી ક્યા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે?
A) કાશ્મીર B) કેરાલા C) હરિયાણા D) મણિપુર

89. સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને ક્યા નામે ઓળખાય છે?
A) તારુતા B) પુષ્પાગર C) રત્નકુંબલ D) વોલડી

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

90. ગકમા સમુદાયના લોકો નીચે પૈકી ક્યા રાજ્યમાં વસે છે?
A) બિહાર B) ઓરિસ્સા C) ઉત્તરપ્રદેશ D) આસામ

91. ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે?
A) બંગાલી B) તેલુગુ C) મરાઠી D) તામિલ

92. "કાલબેલિયા" ક્યા રાજ્યનું નૃત્ય છે?
A) ગુજરાત B) મધ્યપ્રદેશ C) રાજસ્થાન D) બિહાર

93. નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે?
A) નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા B) લલિતકલા અકાદમી
C) સંગીત અકાદમી D) સાહિત્ય અકાદમી

94. પાઝહાસી રાજા આર્કીયોલોજીકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે?
A) વિજયવાડા B) કોઝીકોડ
C) ભુવનેશ્વર D) તિરુચિરાપલ્લી

95. નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્ધારક" ની ઉપાધી મેળવી હતી?
A) શિવાજી B) ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
C) રાજા હર્ષવર્ધન D) ઉપર પૈકી એકપણ નહી.

77)A, 78)D, 79)D, 80)C, 81)A, 82)D, 83)A, 84)D, 85)B, 86)B, 87)A, 88)C, 89)A, 90)D, 91)A, 92)C, 93)C, 94)B, 95)A.

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

96. ક્યુ હિંદુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખુબ આવક મેળવે છે ?
A) તિરુપતિ બાલાજી મંદિર B) કાશી વિશ્વનાથ મંદિર
C) સોમનાથ મંદિર D) મિનાક્ષી મંદિર

97. કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ?
A) 4 વર્ષ B) 8 વર્ષ C) 10 વર્ષ D) 12 વર્ષ

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

98. 'લાવણી' એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ?
A) મહારાષ્ટ્ર B) કેરળ C) બિહાર D) ગુજરાત

99. નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900ની આસપાસમાં ક્યો ગ્રંથ લખ્યો હતો ?
A) સંગીત સંગત , B) સંગીત મકરંદ
C) સંગીત સરીતા D) સંગીત સુધા

100. અજંતા-ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
A) હોશંગાબાદ B) હૈદ્રાબાદ C) ઔરંગાબાદ D) સિકંદરાબાદ

101. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ?
A) શર્મિકા B) ધર્મિકા C) હર્મિકા D) બર્મિકા

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

102. કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય ક્યું છે ?
A) કુચીપુડી B) કથક C) ભરતનાટ્યમ D) કથકલી

103. 'કૂચીપુડી' ક્યા રાજ્યનું નૃત્ય છે ?
A) તમિલનાડુ B) મહારાષ્ટ્ર C) આંધ્રપ્રદેશ D) ઓરિસ્સા

104. માથેરાન ગિરિમથક ક્યા રાજ્યમાં આવેલું છે ?
A) રાજસ્થાન B) મહારાષ્ટ્ર C) ગુજરાત D) મધ્યપ્રદેશ

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

105. બીરજુ મહારાજ ક્યા નૃત્ય માટે જાણીતા છે ?
A) કથકલી B) મણિપુરી C) ભરતનાટ્યમ D) કથ્થક

106. સંત જ્ઞાનેશ્વર .... ભાષાના કવિ છે.
A) હિન્દી B) મરાઠી C) ગુજરાતી D) સંસ્કૃત

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

107. "ઘરાના" શબ્દ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
A) નૃત્ય B) નાટ્ય
C) સંગીત-ગાયન D) ઉપર પૈકી એકપણ નહીં

108. નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર 'મુન્શી પ્રેમચંદ'ની નથી?
A) ગોદાન B) વિમલા C) સેવાસદન D) કફન

109. "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે?
A) ઉત્તરપ્રદેશ B) મધ્યપ્રદેશ C) મહારાષ્ટ્ર D) બિહાર

110. "ત્રિમૂર્તિ" નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?
A) અજંતા B) ઈલોરા C) એલિફન્ટા D) ખંભાલીડા

વિસ્તરણ અધિકારી - 7/1/2017

111. 'મોહીની અટ્ટમ' ક્યા રાજ્યનું નૃત્ય છે ?
A) કેરળ B) આંધ્રપ્રદેશ C) તામીલનાડુ D) કર્ણાટક

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

112. લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?
A) કાલિદાસ - કુમાર સંભવ B) પ્રેમચંદજી - ગૌદાન
C) પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા D) બંકિમચંદ્ર ચેટરજી - આનંદમઠ

113. કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.
A) નાગનૃત્ય B) યક્ષગાન C) ફાગુણ D) પુસૈત

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

114. સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના ક્યા સંતના જીવનમાં બનેલો ?
A) તુકારામ B) સ્વામી સમર્થ
C) જ્ઞાનેશ્વર D) એકનાથજી

HTAT - 2015

115. શ્રી શિવ મહિમ્ન સ્તોત્રના રચયિતા કોણ હતા ? : ગાન્ધર્વરાજ પુષ્પદન્ત

116. સંગીતના મકરંદના લેખક કોણ છે ? : નારદ

HTAT - 2014

117. ચાચા ચૌધરીના પાત્ર દ્વારા કાર્ટૂન સેવા કરનાર સ્વર્ગસ્થ ? : પ્રાણ

118. ક્રાંતિકારી સંતશ્રી સ્વામી સચ્ચિદાનંદે ક્યું સૂત્ર આપ્યું છે ? : વિરતા પરમો ધર્મ

119. સર્વશિક્ષા અભિયાન દ્વારા પ્રકાશિત જ્ઞાનશક્તિનું સૂત્ર ક્યું છે? : વયં રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતા

120. આદિશંકરાચાર્યનું અવસાન ક્યા સ્થળે થયું હતું ? : કેદારનાથ

96)A, 97)D, 98)A, 99)B, 100)C, 101)C, 102)D, 103)C, 104)B, 105)D, 106)B, 107)C, 108)B, 109)D, 110)C, 111)A, 112)C, 113)B, 114)D.

કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર - 2012

121. સુશ્રી. અમૃતા પ્રીતમ કઈ ભાષાના લેખિકા છે ? - **પંજાબી**
122. ગણિત ક્ષેત્રે અસાધારણ ક્ષમતા દર્શાવવા બદલ માનવ કમ્પ્યૂટરનું બિરુદ કોને મળ્યું હતું ? - **શકુંતલાદેવી**
123. ભારતનો સાપુતારાથી કન્યાકુમારી સુધીનો 1600 કિ.મી. લાંબો પશ્ચિમી ઘાટ વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં મુકવાનો નિર્ણય કઈ સંસ્થાએ કર્યો છે ? - **યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)**
124. ધર્મ અને ધાર્મિક સ્થળોની યોગ્ય જોડનો સાચો ક્રમ ક્યો છે ? **- જૈન : જિનાલય, પારસી : અગિયારી, મુસ્લિમ : મસ્જિદ, શીખ : ગુરુદ્વારા**

પોલીસ કોન્સ્ટેબલ - 2012

125. સ્થળ અને રાજ્યનું જોડકું : **ખજુરહો : મધ્યપ્રદેશ, કોણાર્ક : ઓરિસ્સા, નાલંદા : બિહાર, ઈલોરા : મહારાષ્ટ્ર**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

126. મહાકવિ ભાસ લિખિત નાટક ક્યું છે ? - **કર્ણભાર**
127. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? **- મેધિ**
128. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ક્યા શહેરમાં આવેલું છે ? - **ઉજ્જૈન**
129. 'પોંગલ' ક્યા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? - **તમિલનાડુ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

130. ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના ઉદ્ભવ સાથે ક્યો પ્રદેશ સંકળાયેલ છે? - **તામિલનાડું**
131. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? - **ઓસ્ટ્રેલોઈડ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

132. સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. **ખજુરાહોનું મંદિર : મધ્ય પ્રદેશ, સૂર્યમંદિર : કોણાર્ક, માર્તંડ મંદિર : કાશ્મીર, મીનાક્ષી મંદિર : મદુરાઈ**
133. જોડકું સાચુ છે તે શોધીને જવાબ આપો. - **કવિ ભરત - ગીત ગોવિંદમ્, કવિ કાલિદાસ - અભિજ્ઞાન શકુન્તલમ્, કવિ ભવભૂતિ - ઉત્તર રામચરિતમ્**
134. યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. - **રાષ્ટ્રીય અભિલેખાગાર : દિલ્હી, આદિવાસી સંગ્રહાલય : અમદાવાદ, હેમચંદ્રાચાય લાઈબ્રેરી : પાટણ, માટીના અવશેષો : લોથલ**
135. ભારતીય નૃત્યકલા ક્ષેત્રે ક્યું જોડકું સાચુ છે? **- ભરત નાટ્યમ - તમિલનાડુ, કુચીપુડી - આંધ્ર પ્રદેશ, કથ્થકલી અને કથ્થક - કેરળ**

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર ક્લાર્ક - 2012

136. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ 'વિશ્વનાથ' ક્યા રાજ્યમાં આવેલ છે ? - **ઉત્તર પ્રદેશ**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

137. ભારતમાં પ્રથમ જ્ઞાનપિઠ એવોર્ડ વિજેતા મહિલા એટલે - **આશાપૂર્ણા દેવી**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

138. નીચે જરથોસ્તી ધર્મની માહિતી આપી છે જેની યોગ્ય જોડનો સાચો ક્રમ ક્યો થશે ? **- મુખ્યદેવ : અહુરમઝદ, મુખ્ય ગ્રંથ : ઝંદ, મુખ્ય પ્રાર્થના : અહૂનવર, ધર્મગુરુ : મોબેદ**

PSI - 2012

139. કુંભ મેળો ક્યા સ્થળે યોજાય છે ? **- અલાહાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક**
140. કરગમ ક્યાંનું લોક નૃત્ય છે ? - **તામીલનાડુ**

એકાઉન્ટ ઓફિસર - 1999

141. પંડિત રવિશંકર ક્યા વાદ્ય સાથે સંબંધિત છે ? - **સિતાર**
142. **અય મેરે** વતન કે લોકો કવિ પ્રદિપજીનું **ગીત ગાઈ** વિખ્યાત બનાવ્યું ? - **લતા મંગેશકર**

ચીફ ઓફિસર - 1999

143. લોહડી તહેવાર ક્યા રાજ્યમાં મનાવાય છે ? - **પંજાબ**
144. અવેસ્તા ગ્રંથ ક્યા ધર્મ સાથે સંબંધિત છે? - **પારસી**
145. ઋગ્વેદમાં કઈ નદીનો વધુ વખત ઉલ્લેખ જોવા મળે છે ? - **સિંધુ**
146. પંડિત ઓમકારનાથ ક્યા સંગીત સાથે સંબંધિત છે? **- શાસ્રીય સંગીત**
147. ક્યા જૈન તીર્થંકરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો ? **- ભગવાન નેમિનાથ**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

148. તમાશા ક્યા રાજ્યનું લોકનૃત્ય છે? : **મહારાષ્ટ્ર**
149. શ્રીમદ્ ભગવતગીતાના પ્રથમ અધ્યાયનું નામ શું છે ? : **અર્જુનવિષાદ યોગ**
150. ક્યા ધર્મના લોકો અગ્નિ મંદિરમાં પ્રાર્થના કરે છે? : **પારસી**
151. ભારતીય પરંપરા મુજબ શ્રીકૃષ્ણની જનેતા કોણ છે? : **દેવકી**
152. સંત જ્ઞાનેશ્વર ક્યા રાજ્યમાં થઈ ગયા ? : **મહારાષ્ટ્ર**
153. જૈન ધર્મનું સમેત શિખર ક્યાં રાજ્યમાં આવેલું છે? : **ઝારખંડ**
154. ભૂપેન હઝારિકા ક્યા રાજ્યના છે ? : **આસામ**
155. ઉજ્જૈન કઈ નદીના કાંઠે છે ? : **ક્ષિપ્રા**
156. સ્યાદવાદ ક્યા ધર્મનો સિદ્ધાંત છે ? : **જૈન**

157. ભારતના ક્યા મંદિરમાં ભક્તો ભગવાનના ચરણમાં પોતાના વાળની ભેટ ધરીને પૂજા કરે છે? : **તિરુપતી બાલાજી**

158. લિંગાયત સંપ્રદાયના લોકો કોની પૂજા કરતા હતા ? : **શિવલિંગ**

159. કર્ણ કઈ બાબત માટે ઓળખાય છે? : દાનવીર

160. ભગવદ્‌ગીતાનું અંગ્રેજીમાં ભાષાંતર કોણે કર્યું ? : **ચાર્લ્સ વિલ્કિન્સસ**

161. 'લાવણી' નૃત્ય ક્યા રાજ્ય સાથે સંકળાયેલ છે ? : **મહારાષ્ટ્ર**

162. ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ ક્યું ? : **આધ્યાતિમકતા**

163. 19મી સદીના પૂર્વાર્ધમાં સ્થપાયેલું વિશ્વનું નવમા નંબરનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યું ? : **ઈન્ડિયન મ્યુઝિયમ, કલકત્તા**

164. ભારતમાં રોગન ચિત્રકળા.....દેશથી લાવવામાં આવી હતી. - **ઈરાન**

165. અજંટાના ભીંતચિત્રો પર ક્યા ધર્મની વિશેષ અસર જોવા મળે છે ? : **બૌદ્ધ ધર્મ**

166. ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે તે જણાવો. - **નાગર, દ્રવિડ અને વેસર**

167. પંડિત ભીમસેન જોષી ક્યા ઘરાનાના છે તે જણાવો. - **કિરાના**

168. ધુમાલ નાચ ક્યા રાજ્ય સાથે જોડાયેલો છે ? - **જમ્મુ-કાશ્મીર**

169. કુચીપુડી અને ભરતનાટ્યમના રાષ્ટ્રીય નૃત્યકાર છે તેમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'પામ દે ઓર' મળેલ છે ? - **મલ્લિકા સારાભાઈ**

170. મધુબની ચિત્રકલા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - **બિહાર**

171. જોડકાં યોગ્ય રીતે જોડો. - **ભીંત ચિત્રકામ-પદ્મપાણી, પિછવાઈ-ચિત્રસેવા, પોથી ચિત્ર-વસંતવિલાસ, કાંસ્ય મૂર્તિકલા-નટરાજ**

172. છાઉ લોકનૃત્યોમાં નીચેના પૈકી કઈ વસ્તુનો સુંદર રીતે ઉપયોગ થાય છે ? - **મ્હોરાં**

173. કઈ સંત પ્રણાલી મોનેર માનુષના ખ્યાલ પર ભાર મૂકે છે ? - **બાઉલ**

174. પોચમપલ્લી સાડી ક્યા રાજ્યમાં વણાય છે ? - **તેલંગાણા**

175. ક્યા તહેવારમાં હોડી સ્પર્ધા ખૂબ જ અગત્યતા ધરાવે છે ? - **ઓણમ**

176. તાજ ઉલ મસ્જિદ ક્યા આવેલી છે ? - **ભોપાલ**

177. ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? - **હિમાચલ પ્રદેશ**

178. લિટ્ટિ ચોખા ક્યા રાજ્યની ખાસ વાનગી છે ? - **બિહાર**

179. યોગ્ય જોડકા જોડો. - **બાટીક શૈલી- બંગાળ, ગોંદ ચિત્રકલા-મધ્ય પ્રદેશ, કલમકારી ચિત્રકારી- આંધ્ર પ્રદેશ, પટચિત્ર ચિત્રકલા- ઓડિશા**

180. ભારતના ક્યા રાજ્યમાંથી પથ્થરના શિલ્પો મળેલા છે ? - **હિમાચલ પ્રદેશ**

181. 'કલ્પસૂત્ર' કઈ બાબત માટે જાણીતી છે ? - **લઘુચિત્રો**

182. નવરાત્રિના ઉત્સવની શરૂઆત ....થી થાય છે. - **મહાલયા**

183. ચેરાઉ નૃત્ય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - **મિઝોરમ**

184. 'ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત કોઈ'ના રચયિતા કોણ છે ? - **કબીર**

185. દૈવશક્તિના નિવાસ સ્થાન એવા ભારતીય મંદિર માટે પ્રયોજાતો શબ્દ જણાવો. - **દેવાયતન**

186. ઉજ્જૈનમાં ક્યું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? - **મહાકાળેશ્વર મંદિર**

187. મોહિનીઅટ્ટમ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? - **પ્રશિષ્ટ નૃત્ય પ્રકાર**

188. ગોદાન કૃતિના સર્જક કોણ છે ? - **મુન્શી પ્રેમચંદ**

189. હવા મહેલ તો જયપુર તેવી રીતે ચાર મિનાર તો ? - **હૈદરાબાદ**

190. 'ગોરા' પુસ્તકના લેખક કોણ છે ? - **રવીન્દ્રનાથ ટાગોર**

191. વલ્લમકલીનો ઉત્સવ ક્યા રાજ્યમાં ઉજવામાં આવે છે ? - **કેરળ**

192. 29 સ્વરોનો પરિચય આપ્યો હોય તેવી સંગીત પારિજાત પુસ્તકનો રચનાકાર કોણ છે ? - **પંડિત અહોબલ**

193. મહિષાસુર ક્યા ચિત્રકારની રચના છે ? - **તૈયબ મહેતા**

194. મક્કાહ મસ્જિદ ક્યાં આવેલી છે ? - **હૈદરાબાદ**

195. તાજેતરમાં શરૂ કરવામાં આવેલ હૃદય (HRIDAY) યોજનાનો હેતુ......... - **સાંસ્કૃતિક ધરોહરોની જાળવણી કરવી**

196. 'અવિગતિ નિરમૈલી ઉપજે નિરગુણ તે સગુણ થીયા' કોણે કહેલું છે ? - **ગુરુ નાનક**

197. પટ્ટચિત્ર ચિત્રકલા ક્યા રાજ્ય સાથે જોડાયેલી છે ? - **ઓડિશા**

198. ભારતના ક્યા રાજ્યમાંથી મંદિર શિલ્પો પ્રાપ્ત થયેલા છે ? - **ત્રિપુરા**

199. અજંતાની ગુફા સાથે ક્યો જિલ્લો જોડાયેલ છે ? - **ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)**

200. ડીસ્કવરી ઓફ ઈન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? - **જવાહરલાલ નેહરુ**

201. કામાયની કૃતિના સર્જક કોણ છે? - **જયશંકર પ્રસાદ**

202. મણિકમાલાનો સ્તુપ કઈ શૈલીમાં છે ? - **ગાંધાર શૈલી**

203. 'પ્રભુજી તુમ ચંદન હમ પાની'- આ પદના કવિનું નામ જણાવો. - **રૈદાસ**

204. કઈ શાળાના વિદ્યાર્થીઓને ઈસ્લામિક ગ્રંથો ઉપર ધ્યાન કેન્દ્રીત કરાવાય છે ? - **દેવબંદ શાળા**

205. પન્નાલાલ ઘોષ ક્યા વાદ્યવાદક હતા ? - **વાંસળી**

206. કેદારનાથ, કલાહસ્તી, ચિદમ્બરમ, નટરાજ રામેશ્વર મંદિરો કેટલા રેખાંશ પર આવેલા છે ? - **79° રેખાંશ**

207. સોનપુર પશુ મેળો ક્યા રાજ્યમાં આયોજિત થાય છે ? - **બિહાર**

208. ગણગોર તહેવાર ક્યા રાજ્યમાં ઉજવાય છે ? - **રાજસ્થાન**

209. 'પુરન બ્રહ્મ વિચારીયે જબ સકલ આત્મા એક' કોણે ઉચ્ચારેલું છે ? - **દાદુ દયાલ**

210. નિરગ્રંથનો અર્થ શું છે ? - **બંધનમુક્ત**

211. 'ઈકોનોમિક હિસ્ટ્રી ઓફ બ્રિટીશ ઈન્ડિયા' પુસ્તકના લેખક જણાવો. - **આર.સી.દત્ત**

212. નવરાત્રિનો ઉત્સવ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ સાથે સંબંધિત છે, આ વિધાન. - **સાચુ છે**

213. મલ્લિકા સારાભાઈ ક્યા નૃત્યના જ્ઞાતા છે ? - **ભરતનાટયમ, કુચીપુડી**

214. યોગ્ય જોડકા જોડો. - **પંજાબ-ભાંગડા, ગુજરાત-ગરબો, કેરળ-મોહિની અટ્ટમ, આંધ્ર પ્રદેશ- કુચીપુડી**

215. બારમી સદીના કર્ણાટકી ભાષાના કવિ, ફિલસૂફ અને સમાજસુધારક કોણ હતા ? - **બસવાના**

216. અમરાવતીની કલાકૃતિ કઈ શૈલીમાં જોવા મળે છે ? - **મથુરા શૈલી**

217. ક્યુ નાટક બાળકીઓના વેચાણની પ્રથા ઉપર આધારિત છે ?- **કન્યા**

218. કેદારનાથ, કૈલાહસ્તી, ચિદમ્બરમ્, નટરાજ, રામેશ્વર વગેરે મંદિરોમાં કોના સ્વરૂપ છે ? - **શિવ**

219. 'મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઈ' કોની રચના છે ? - **મીરાંબાઈ**

220. ક્યા ગ્રંથમાં ૧૭ પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ જણાવેલ છે ? - **સંગીત મકરંદ**

221. પઈટકર ચિત્રકલા ક્યા રાજયમાં પ્રચલિત બની છે ? - **ઝારખંડ**

222. દેવાસનોપડો ....છે.- **જૈન હસ્તપ્રત**

223. નાગાર્જુન કોંડા સ્તુપ કઈ શૈલીમાં કોતરાયેલ છે ? - **દ્રવિડ શૈલી**

224. કલ્ચૂરી રાજવંશના સમયના મુખ્યમંત્રી અને અનુભવો મંડપાનું આયોજન કોણે કરેલ હતું ? - **બસવાના**

225. નાલંદાના વિહારો કઈ શૈલીમાં કોતરાયેલા છે ? - **ગુપ્તકાલીન કલા શૈલી**

226. યોગ્ય જોડકા જોડો. - **મોહનવીણા-વિશ્વમોહન, તબલા-ઝાકીર હુસૈન, સિતાર-મંજુ મહેતા, સરોદ-અમાન અલીખાન**

227. ઝુમર નાચ ક્યા રાજય સાથે સંબંધિત છે ? - **પંજાબ**

228. ઢાંક્ની ગુફાઓ ગુજરાતના ક્યા જિલ્લામાં જોવા મળે છે ? - **રાજકોટ**

229. સંગીતના અભ્યાસ માટે જરૂરી ગ્રંથ 'સંગીત રત્નાકર' કોની કૃતિ છે ? - **પંડિત સારંગદેવ**

230. ખ્યાતનામ નૃત્ય કરા શિવશિલ્પ નટરાજ ક્યા સમૂહનું છે ? - **ચોલા બ્રોન્ઝ**

231. કૃતિ અને લેખકના જોડકા જોડો. - **કર્ણભાર-મહાકવિ ભાસ, અભિજ્ઞાન શાકુંતલમ-મહાકવિ કાલિદાસ, શામળ શાહનો વિવાહ-નરસિંહ મહેતા, માલતી માધવ-કવિ ભવભૂતિ**

232. છાયાવાદ કૃતિના સર્જક કોણ છે ? - **મહાદેવી વર્મા**

233. ચેરિયાલ શું છે ? - **ભારતીય પ્રશિષ્ટ ચિત્રકલાનો એક પ્રકાર**

234. લુસાંગ ઉત્સવ ક્યા રાજયમાં ઉજવાય છે ? - **સિક્કિમ**

235. મધ્ય પ્રદેશના ક્યા જિલ્લામાં ઉદયગીરીની ગુફાઓ આવેલી છે? - **વિદિશા**

236. મણીપુરનું ક્યું સૌથી લોકપ્રિય નૃત્ય છે ? - **ખાંભા તોઈબી**

237. આરી ખટલા શું છે ? - **ધાતુની મોટી સોયથી કરાતું ભરતકામ**

238. મહોરમ શા માટે થાય છે ? - **ઈમામ હુસેનની શહાદત થઈ હતી તે મહિનો**

239. કલમકારી ચિત્રકલા ક્યા રાજય સાથે વણાયેલી છે ? - **આંધ્ર પ્રદેશ**

240. તાજેતરમાં જેમનું અવસાન થયું એવા ઉસ્તાદ સૈયદુદીન ડાગર હિંદુસ્થાની સંગીતની............પરંપરાના ઉસ્તાદ હતા. - **ધ્રુપદ**

241. યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની પસંદગી કરવામાં આવે છે, તેમાં સૌથી વધુ સમાવિષ્ટ સ્થળો ભારતના ક્યા રાજયના છે? - **તમિલનાડુ**

242. નિરુક્ત કઈ બાબતને લગતો ગ્રંથ હતો ? - **ભાષા વિજ્ઞાન**

243. વિષ્ણુ દિગંબર પલુસકર ક્યા ઘરાણાના છે ? - **ગ્વાલિયર ઘરાણા**

244. મહર્ષિ રમણનો જન્મ ક્યા થયો હતો ? - **મદુરાઈ નજીક**

245. ઠુમરી ગાયિકા ગીરીજાદેવી ક્યા ઘરાનાના છે ? - **બનારસ ઘરાના**

246. કિશોરી અમોનકર ક્યા ઘરાણા સાથે સંબંધિત છે ? - **જયપુર ઘરાણા**

247. મુસ્લિમોમાં પવિત્ર દિવસો અંગે શબે મેરાજ શું છે ? - **તે રાતે હજરત પયગંબર સાહેબ અલ્લાહ પાકની મુલાકાતે ગયેલા**

248. રાઉત નાચ ક્યા રાજય સાથે જોડાયેલો છે ? - **છત્તીસગઢ**

249. 'બટુકમા' ક્યા રાજયનો ઉત્સવ છે ? - **તેલંગાણા**

250. ભારતમાતા ક્યા ચિત્રકારની કૃતિ છે ? - **અવનિન્દ્રનાથ ટાગોર**

251. માઘ મેળો ક્યા આયોજિત થાય છે ? - **ઉત્તર પ્રદેશ**

252. પટ્ટચિત્રકલા ક્યા રાજયમાં પ્રચલિત છે ? - **ઓડિશા**

253. ગિરિજાદેવી ક્યા ઘરાણા સાથે જોડાયેલા છે ? - **બનારસ ઘરાણા**

254. 'ઘનેટી' અને 'ઢેબરીયા' શું છે ? - **ભરતકામની કલાઓ**

255. લીલાવતી કઈ બાબતને લગતો ગ્રંથ છે ? - **ગણિત**

256. દશેરાનો મેળો ક્યા રાજયમાં યોજાય છે ? - **હિમાચલ પ્રદેશ**

257. ચેરીયલ શૈલી ક્યા રાજ્ય સાથે સંકળાયેલી છે ? - **તેલંગાણા**

258. સોનલ માનસિંગ ક્યા નૃત્ય સંબંધિત છે ? - **કુચીપુડી**

259. શહીદોનો મેળો ક્યા રાજયમાં ભરાય છે ? - **પંજાબ**

260. ક્યો ઉત્સવ દેવીપક્ષની શરૂઆત અને પિતૃપક્ષના અંતનું પ્રતિક હોય છે ? - **નવરાત્રિ**

261. કાલીઘાટ શૈલી એટલે ક્યું રાજ્ય ? - **બંગાળ**

262. સંતશ્રી જલારામ બાપાનો જન્મ ક્યા થયો હતો ? - **વીરપુર**

263. શાકુંતલા ક્યા ચિત્રકારની કૃતિ છે ? - **રાજા રવિવર્મા**

264. મુસ્લિમોના પવિત્ર દિવસોમાં ઈદ-એ-ગદીર શું છે? - **તે દિવસે હજરત પયગંબર સાહેબે અલીને પોતાના વારસ નિમ્યા હતા**

265. તમિલનાડુનો તાંજોર જિલ્લો .... નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. - **ભરતનાટ્યમ**

266. સ્વામી વિવેકાનંદનું જન્મ સ્થળ જણાવો. - **કોલકાતા**

267. સંરક્ષિત સ્મારકોના કેટલા મીટરની અંદર બાંધકામની મનાઈ છે? - **100 મીટર**

268. ગંજીફા શૈલી શહેર સાથે સંબંધિત છે. - **મૈસૂર**

269. 'મેરા હો ચાંગબા' ક્યા રાજ્યનો ઉત્સવ છે ? - **મણિપુર**

270. ક્યા નૃત્યો UNESCOની અમૂર્ત વારસાની યાદીમાં સામેલ છે ? - **કાલબેલિયા અને છાઉ/છાહુ**

271. યમપુરી.....છે. - **કઠપુતળીના પ્રકાર**

272. કન્થ ચિત્રકલા ક્યા રાજ્ય સાથે જોડાયેલ છે ? - **બંગાળ**

273. આ નૃત્ય પુરુષો દ્વારા હાથમાં લાંબી લાકડીઓ લઈ કરવામાં આવે છે. લાકડીના છેડે ઘૂઘરી બાંધેલી હોય છે. આ નૃત્ય.......ના નામે જાણીતું છે. - **આગ્રા**

274. કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો 'પ્રેમ-વાટિકા'ના રચયિતા .... છે. - **રસખાન**

275. મધુબની ચિત્રકલાનું રાજ્ય જણાવો. - **બિહાર**

276. યોગેન્દ્ર દેસાઈ ક્યા નૃત્યના કલાકાર હતા ? - **કથકલી અને ભરતનાટ્યમ**

277. સરહુલ ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? - **ઝારખંડ**

278. નાગાર્જુન કોંડાનો સ્તુપ કઈ શૈલીનો ઉત્તમ નમૂનો છે ? - **દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી**

279. સિતાર, તબલા અને સારંગી સંગીત વાદ્યો ક્યા મૂળના છે? - **ભારતીય ઈસ્લામિકના સંયુક્ત મૂળના**

280. દૂતવાક્યમ, કર્ણભાર અને ઊરુભંગ નાટકના રચયિતા કોણ હતા ? - **મહાકવિ ભાસ**

281. માલતીમાધવ, ઉત્તર રામચરિત, માલવિકાગ્નિમિત્રમ્ કોની કૃતિઓ છે ? - **મહાકવિ ભાસ**

282. ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે જાણીતું બનેલ વિદ્યાકેન્દ્ર ક્યું હતું ? - **વારાણસી (કાશી)**

283. હિર ગીત ક્યા રાજ્યમાં ગવાય છે ? - **પંજાબ**

284. ઉર્દૂને એક ચોક્કસ સ્વરૂપ, તત્વ અને શૈલી કોણે આપી હોવાનું કહેવાય છે ? - **વલી દખ્ખણી**

285. ગુરબાની ભજન ક્યા પવિત્ર ગ્રંથનો ભાગ છે ? - **ગુરૂ ગ્રંથ સાહેબ**

286. ભારતનું ક્યું મંદિર 'બ્લેક પેગોડા' તરીકે જાણીતું છે ? - **સૂર્યમંદિર, કોણાર્ક**

287. ભત્યાલી ગીત ક્યા રાજ્યમાં ગવાય છે ? - **બંગાળ**

288. પિથોરા ચિત્રકલા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - **ગુજરાત**

289. ક્યા ઉત્સવો જાન્યુઆરી મહિનામાં સાથોસાથ ઉજવાય છે ? - **મકર સક્રાંતિ, પોંગલ, લોહરી**

290. હમ્પી સંસ્કૃતિ ભારતના ક્યા રાજ્યમાં પાંગરી હતી ? - **કર્ણાટક**

291. દ્રવિડકુળની ભાષામાં કઈ ભાષાનો સમાવેશ કરી શકાય ? - **તમિળ, કન્નડ, મલયાલમ**

292. રાસ નૃત્ય સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - **ઉત્તર પ્રદેશ**

293. કઈ શાળાના વિદ્યાર્થીઓને ઉલેમાઓની ભૂમિકા ગ્રહણ કરવા તૈયાર કરાય છે ? - **દેવબંદ શાળા**

294. સ્તુપના અંડાકાર ભાગની ટોચની ચારેબાજુએ આવેલી રેલીંગને .... કહે છે. - **હર્મિકા**

295. બૌદ્ધ ગ્રંથોમાં કેટલા સંપ્રદાયો કે ચિંતન પરંપરાઓનો ઉલ્લેખ મળે છે ? - **64**

296. બૌદ્ધ ધર્મના મોટાભાગના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે ? - **પાલી**

297. જૈન ધર્મના ક્યા સિદ્ધાંતે સંપૂર્ણ ભારતીય ચિંતન પરંપરાને પ્રભાવિત કરી છે ? - **અહિંસા**

298. ભારતના ક્યા વિસ્તારમાંથી બ્રોન્ઝ શિલ્પો પ્રાપ્ત થયેલા છે ? - **દક્ષિણ ભારત**

299. કાંગડા ચિત્રશૈલીનો મુખ્ય વિષય ક્યો રહ્યો છે ? - **કૃષ્ણભક્તિ**

300. નંદલાલ બોઝ, મનજિત બાવા, તૈયબ મહેતાએ ક્યા ક્ષેત્રમાં અગત્યનું પ્રદાન કરેલું છે ? - **ચિત્રકલા**

301. નટરાજનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે ક્યા સંગ્રહાલયમાં સચવાયેલું છે ? - **ચેન્નાઈ**

302. બ્રીજભૂષણ કાબરા કઈ કલા માટે પ્રખ્યાત છે ? - **ગીટાર વાદન**

303. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ ભારત દેશના ક્યા મંદિરે યાત્રાળુઓના સંદર્ભે યોગ્ય વ્યવસ્થાપન ગોઠવવા આદેશ કર્યો છે ? - **ઓરિસ્સાના જગન્નાથ મંદિર માટે**

304. રંગે શ્યામ, લાંબું, પહોળુ માથુ, ચપટુ નાક, ટૂંકુ કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી........- **ઓસ્ટ્રેલોઈડ (નિષાદ) પ્રજા હતી.**

305. ગુલાબી રંગની મીનાકારી માટે ક્યું સ્થળ જાણીતું છે ? - **વારાણસી**

306. ભારતમાં રેતીના શિલ્પો પ્રાપ્ત થયેલા છે. - **ઓરિસ્સા**

307. કઈ નૃત્યશૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને 'કુમીન' કહે છે ? - **મણિપુરી**

308. 'મહાવીરચરિતમ્' કોની કૃતિ છે ? - **ભવભૂતિ**

309. પહાડ શૈલી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - **રાજસ્થાન**

310. બાપુજી ક્યા ચિત્રકારની રચના છે ? - **નંદલાલ બોઝ**

311. બડસેની ગુફાઓ ક્યા જિલ્લામાં જોવા મળે ? - **પુણે (મહારાષ્ટ્ર)**

312. જાણીતું શ્રીનાથજી મંદિર ક્યા આવેલું છે ? - **નાથદ્વારા**

વિશ્વનો ઈતિહાસ

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

1. છ યુરોપીયન દેશો દ્વારા ક્યા વર્ષમાં યુરોપીયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના થઈ ?
A) 1951 B) 1947 C) 1948 D) 1950

GPSC પ્રિલિમ - 2007

2. બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
A) નઝરૂલ ઈસ્લામ B) ખાલિદા ઝિયા
C) શેખ હસીના વાજેદ D) શેખ મુજિબુર રહેમાન

PSI/ASI GK - 2/5/2015

3. ઝીગુરાત (ZIGURAT) કઈ સંસ્કૃતિની અજાયબી છે ?
A) બેબીલોન સંસ્કૃતિ B) મિસર સંસ્કૃતિ
C) સિંધુ સંસ્કૃતિ D) ગ્રીક સંસ્કૃતિ

4. ચીનની મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું છે ?
A) સમ્રાટ ચેન B) સમ્રાટ શી-હવાંગટી
C) સમ્રાટ વુટી D) સમ્રાટ યુ

5. ચીનની સંસ્કૃતિમાં કઈ મહત્વની શોધ થઈ છે ?
A) બેરોમીટર B) થરમોમીટર C) હોકાયંત્ર D) વાજીંત્રો

6. ક્યા દેશને લોકશાહીની જનેતા કહે છે ?
A) ફ્રાંસ B) ભારત C) અમેરિકા D) ઈંગ્લેન્ડ

7. વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?
A) માર્ગારેટ થેચર B) એલીઝાબેથ ટેલર
C) મેરી આંતવા D) જ્હોન ઓફ આર્ક

8. બિસ્માર્કને જર્મનીના ક્યા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ?
A) શક્તિ પુરૂષ B) લોખંડી પુરૂષ
C) યુગ પુરૂષ D) મહાત્મા પુરૂષ

9. સત્યવીર તરીકે ક્યા મહાનુભાવ ઓળખાય છે ?
A) સોક્રેટીસ B) સિકંદર
C) સોફોક્લીસ D) હોમર

10. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ?
A) 1931-35 B) 1914-18 C) 1911-14 D) 1939-45

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

11. ફિડેલ કાસ્ટ્રોનું તાજેતરમાં નિધન થયું. તેઓ લાંબા સમય સુધી કયા દેશના રાષ્ટ્રપ્રમુખ હતાં?
A) કેન્યા B) ઝાંબીયા C) કેમરૂન D) ક્યૂબા

નાયબ ચિટનીશ - 05/02/2017

12. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ?
A) જાન્યુઆરી, 1995 માં B) ઓક્ટોબર, 1996 માં
C) ઓક્ટોબર, 1990 માં D) ઓક્ટોબર, 2001 માં

GPSC Class - 2 - 18/03/2017

13. યાદી-1 અને યાદી-2ને યોગ્ય રીતે જોડીને વિકલ્પ પસંદ કરો.

યાદી-1	યાદી-2
(I) યુરેપા	1) ગુરુ
(II) સૌંદર્યનો ગ્રીક દેવતા	2) સિરસ (ceres)
(III) સૌથી મોટો એસ્ટેરોઈડ	3) શનિ
(IV) ટાઈટન	4) વિનસ

	(I)	(II)	(III)	(IV)
(A)	3	4	2	1
(B)	1	4	3	2
(C)	3	4	1	2
(D)	1	4	2	3

GPSC Class - 1 - 28/01/2017

14. તાસ્કંદ કરાર કઈ સાલમાં થયા હતા?
A) ઈ.સ.1964 B) ઈ.સ.1965
C) ઈ.સ.1957 D) ઈ.સ.1955

GPSC Class - 2 - 16/04/2017

15. 'હન્ડ્રેડ ઈયર વોર' ક્યા દેશો વચ્ચે થયેલ છે ?
A) ફ્રાન્સ અને જર્મની B) જર્મની અને ઓસ્ટ્રેલિયા
C) ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ D) ઈંગ્લેન્ડ અને જર્મની

1)A, 2)D, 3)A, 4)B, 5)C, 6)D, 7)A, 8)B, 9)A, 10)B, 11)D, 12)C, 13)D, 14)B, 15)C.

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર કલાસ - 2 (25/2/2017)

16. દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ Wafeare State ઊભું કર્યું ત્યારે તેના વિરોધમાં કોણે કલ્યાણ રાજ્યનો ખ્યાલ આપ્યો ?
A) બિસ્માર્ક B) વિલિયમ ટેમ્પલ
C) ફ્રેડરિક વોન D) ગાંધીજી

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

17. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો ? - 1914

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

18. કઈ રાજ્યક્રાંતિએ વિશ્વને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મહામૂલ્ય સિદ્ધાંતો આપ્યા ? - ફ્રેંચ રાજ્યક્રાંતિએ

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

19. ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન મોટા ભાગના વિકાસશીલ દેશોએ કઈ નીતિ અપનાવી ? - બિન જોડાણવાદી

PSI - 2012

20. બર્માનું નવું નામ શું છે ? - મ્યાનમાર

એકાઉન્ટ ઓફિસર - 1999

21. પ્રાચીન રોમન સમ્રાટ ક્યા નામે ઓળખાતા ? - સિઝર

આંકડાકીય અધિકારી - 2000

22. ચીનની મહાન દીવાલ બાંધનાર રાજા કોણ હતા ? - શી-હ્વાંગ-ટી

ચીફ ઓફિસર - 1999

23. ક્યા વર્ષે ગાંધીજીને આફ્રિકામાં રંગભેદનો અનુભવ થયો હતો? - 1893
24. અબ્રાહમ લિંકન ક્યા કારણે જાણીતા બન્યા ? - ગુલામીપ્રથા દૂર કરી

વૈદકિય સેવા - 2000

25. મોન્તેસ્કને કઈ ક્રાંતિનો પ્રણેતા મનાય છે ? - ફ્રાન્સની ક્રાંતિ

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

26. જર્મનીનું એકીકરણ ક્યારે થયું ? : 1990
27. એથેન્સ કઈ સંસ્કૃતિનું કેન્દ્ર હતું ? : ગ્રીક
28. બ્રિટનના સૌથી પહેલા વડાપ્રધાન કોણ હતા ? : રોબર્ટ વાલપોલ
29. ઈ.સ. 1793માં ફ્રાન્સના ક્યા રાજાને ફાંસી અપાઈ ? : લૂઈ 16મો
30. વેદોને સૌપ્રથમ અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? : મેક્સમૂલર
31. કોરિયાનું ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એવા બે ભાગમાં વિભાજન ક્યા વર્ષે થયું ? : 1948 (1945-48 સુધી સૈન્ય સરકાર)
32. ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનો પ્રયાસ કરનાર પેલેસ્ટાઈનનો રાજા કોણ હતો ? : હેરોદ
33. રશિયામાં ક્યારે ક્રાંતિ થઈ ? : 1917
34. એરિસ્ટોટલના ગુરુ કોણ હતા ? : પ્લેટો
35. જર્મનીમાં નાઝીવાદના પ્રણેતા કોણ હતા ? : હિટલર
36. વોટરલૂની લડાઈ ક્યા વર્ષમાં થઈ હતી ? : ઈ.સ. 1815
37. ચીનમાં સામ્યવાદનું શાસન ક્યા વર્ષમાં શરૂ થયું ? : 1949
38. મિશ્રની સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાંગરી હતી ? - નાઈલ
39. હમ્બુરાવી નામનો મહાન શાસક કઈ સંસ્કૃતિમાં થઈ ગયો ? - બેબીલોનિયન
40. રોમના લોકોની મુખ્ય ભાષા કઈ હતી ? - લેટિન
41. ઈરાનનો મુખ્ય ધર્મ ક્યો હતો ? - પારસી
42. મિશ્રની સંસ્કૃતિના પ્રથમ શાસક કોને માનવામાં આવે છે ? - મેનિસ
43. રોમના ક્યા શાસકના નામ પરથી જુલાઈ મહિનાનું નામ પડ્યું હોય તેવું મનાય છે ? - જુલિયસ સિઝર
44. જર્મનીમાં કોના સમયમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો ? - હિટલર
45. યુનાઈટેડ નેશન્સની સ્થાપના પાછળ ક્યું કારણ જવાબદાર છે ? - બીજું વિશ્વયુદ્ધ
46. યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ક્યો સંઘર્ષ થયો હતો ? - સપ્તવાર્ષિક યુદ્ધ
47. લોહિયાળ રવિવારની ક્રાંતિ એટલે ? - રશિયન ક્રાંતિ
48. જર્મનીએ ક્યા દેશ પર આક્રમણ કર્યું જે કારણોસર દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ? - પોલેન્ડ
49. બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલો છે ? - અમેરિકન ક્રાંતિ
50. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે શાંતિ જાળવવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? - લીગ ઓફ નેશન્સ
51. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા ચિંતકો કોણે આપ્યા ? - ગ્રીસ
52. બીજા વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો ? - 61
53. એરમાઈક લિપિ કઈ સંસ્કૃતિ સાથે સંબંધિત છે ? - આર્મિનિયન
54. કઈ સંધિને કારણે જર્મનીનું વિભાજન થયું ? - વર્સેલ્સની સંધિ
55. કઈ સંધિ અનુસાર અમેરિકા સ્વતંત્ર દેશ જાહેર થયો ? - પેરિસ સંધિ

16)B.

ગુજરાતની ભૂગોળ

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?
A) 1980 B) 1970 C) 1969 D) 1965

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

2. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ?
A)ઓખા B)પોરબંદર C)ઉકાઈ D)ધુવારણ
3. ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?
A)ટીમરૂ B)ખેર C)ચીડ D)દેવદાર
4. ક્યુ ખનિજ દરિયાના પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ?
A)લિગ્નાઈટ B)બોક્સાઈટ C)ડોલોમાઈટ D)ગ્રેફાઈટ
5. ક્યા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે?
A)શેરડી B)બાજરી C)ઘઉં D)એરંડા

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

6. નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર ક્યા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?
A)લાલબહાદુર શાસ્ત્રી B)સરદાર વલ્લભભાઈ પટેલ
C)ગાંધીજી D)જવાહરલાલ નેહરુ
7. ક્યા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ?
A)કપાસ B)ગુલાબ C)શેરડી D)જુવાર

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

8. ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?
A)સપ્ટેમ્બર-ઓક્ટોબર B)ઓક્ટોબર-ડિસેમ્બર
C)માર્ચ-એપ્રિલ D)જૂન-જુલાઈ
9. ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે?
A)નર્મદા B)સાબરમતી C)તાપી D)મહી

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

10. ખંભાતના અકીક ઉદ્યોગને ક્યા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?
A)તારંગાના B)બનાસકાંઠા જિલ્લાના
C)રાજપીપળાના D)ચોટીલાના
11. ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યા આવેલો છે ?
A)પાટડી B)ચારણકા C)વારાહી D)રાધનપુર

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

12. ગુજરાતમાં બોક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે?
A)કચ્છ અને જામનગર B)મહેસાણા અને પાલનપુર
C)વડોદરા અને ખેડા D)પંચમહાલ
13. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ?
A)GROFED B)GUJCOMASOL
C)ATIRA D)NDDB

GPSC પેપર - 2 - 2017

14. નીચેના પૈકી ક્યા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ?
A)રાજકોટ B)સુરત C)રતલામ D)સોલાપુર
15. ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી ક્યા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે ?
A)આયાતકાર B)વૃક્ષાકાર C)જાળીઆકારD)ત્રિજ્યા
16. ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી?
A)રોટરડેમ પોર્ટ B)ચાબાહાર પોર્ટ
C)મોન્ટ્રીયલ પોર્ટ D)ઉપરના પૈકી કોઈ નહીં
17. ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ?
A)અમદાવાદ - હાવરા B)નવજીવન
C)ઓખા - રામેશ્વરમ્ D)તાપ્તી - ગંગા
18. કેન્દ્રિય મૃદા લવણતા સંશોધન સંસ્થાન (Central Soil Salinity Research Institute)નું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A)ભાવનગર B)ભરૂચ C)વેરાવળ D)મુન્દ્રા
19. ગુજરાતના અર્થતંત્રમાં ક્યું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ?
A)પ્રાથમિક B)દ્વિતીય
C)તૃતીય D)ઉપરના બધા જ સરખો ફાળો આપે છે
20. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક - સીટી (GIFT - City) ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ (Consulate office) ખોલનાર પ્રથમ દેશ કયો છે ?
A)તાંઝાનિયા B)ચીન C)બેલ્જિયમ D)યુ.એસ.એ.

1)D, 2)C, 3)B, 4)C, 5)D, 6)B, 7)A, 8)A, 9)A, 10)C, 11)B, 12)A, 13)C, 14)D, 15)D, 16)A, 17)C, 18)B, 19)B, 20)C.

GPSC MAINS પેપર - 2 - 2016

21. સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતા કેટલી છે?
A) 1200 MW B) 1250 MW C) 1400 MW D) 1450 MW

22. ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યા મળી આવે છે ?
A) લોથલ B) બાલાસિનોર C) ધોળાવીરા D) જૂનાગઢ

23. છારી ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય (રિઝર્વ) ક્યા આવેલુ છે ?
A) પશ્ચિમ બંગાળ B) ગુજરાત
C) કેરળ D) ઓડિસા

24. કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી ક્યો છે ?
A) લહેરાતા આગળ ધસી આવેલા ભાગ
B) કળણવાળા ખારા પાટ
C) આંગળી જેવા ઢગલા
D) પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો

25. પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનોમોટો ભાગ ક્યા ભૂકંપ ઝોન (Seismic Zone)માં આવે છે ?
A) ઝોન II B) ઝોન III C) ઝોન IV D) ઝોન V

26. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસતીમાં તેની અગાઉની વસતી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ?
A) 21 % B) 23 % C) 25 % D) 27 %

27. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
A) તળાવ B) બંધારા C) લગૂન D) અખાત

28. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?
A) જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ
B) આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો)
C) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ
D) ગ્રીન હાઉસ અને શેડ નેટ હાઉસ

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

29. પૂર્ણા નદીનું ઉદ્દગમસ્થાન ક્યું છે ?
A) પીપળનેરના ડુંગરમાંથી B) ડાંગના જંગલમાંથી
C) વાંસદાના ડુંગરમાંથી D) ધરમપુરના ડુંગરમાંથી

30. ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ?
A) 4 B) 5 C) 6 D) 3

31. ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ (PANAMAX) જહાજો માત્ર...... બંદરે જ લાંગરી શકે છે.
A) મુંદ્રા B) મુંબઈ C) માર્માગોવા D) કોચી

32. ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ?
A) ઈ.સ.1975 B) ઈ.સ.1980 C) ઈ.સ.1982 D) ઈ.સ.1985

33. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર.......... જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર..... જિલ્લામાં છે.
A) અમદાવાદ, ડાંગ B) મહેસાણા, ડાંગ
C) વડોદરા, દાહોદ D) સુરત, ડાંગ

34. ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ?
A) પીપોદરા B) લીંગડા C) ઓખા D) પાલણ

35. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી ?
A) ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભ્યારણ્ય
B) જામનગર જિલ્લો - ગાગા અભ્યારણ્ય
C) રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભ્યારણ્ય
D) અમરેલી જિલ્લો - રામપુર અભ્યારણ્ય

PSI GK - 1/1/2017

36. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ?
A) 1200 કિમી B) 1600 કિમી C) 2000 કિમી D) 800 કિમી

37. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?
A) કાંપમય માટી B) લેટરાઈટ માટી
C) કાળી માટી D) લાલ માટી

38. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
A) સહ્યાદ્રી B) વિંધ્ય C) અરવલ્લી D) સાતપુડા

39. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ?
A) કરજણ B) તાપી C) નર્મદા D) મહી

40. નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી ?
A) બિટુમિનસ B) લિમોનાઈટ C) લિગ્નાઈટ D) એન્થ્રાસાઈટ

PSI GK - 4-3/5-3/2017

41. ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે ?
A) 500 મીટર B) 800 મીટર C) 1100 મીટર D) 1500 મીટર

કોન્સ્ટેબલ - 2015

42. નર્મદા નદીનું મૂળ ક્યું છે ?
A) સહ્યાદ્રી B) મૈકલ C) અમરકંટક D) પૂર્વઘાટ

43. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો છે ?
A) જેસોર B) બરડો C) શેત્રુંજો D) ગિરનાર

44. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
A) ડાંગ B) દાહોદ C) બનાસકાંઠા D) પંચમહાલ

21)D, 22)B, 23)B, 24)B, 25)D, 26)D, 27)C, 28)B, 29)A, 30)B, 31)A, 32)C, 33)B, 34)C, 35)D, 36)B, 37)C, 38)A, 39)B, 40)B, 41)B, 42)C, 43)D, 44)B.

45. ભારતના ક્યા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે ?
A) ગુજરાત B) તમિલનાડું C) કર્ણાટક D) આંધ્ર પ્રદેશ
46. નીચેનામાંથી ક્યું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી?
A) સિંહ B) કાળિયાર C) વાઘ D) નીલગાય
47. ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂશન ક્યાં આવેલું છે ?
A) વડોદરા B) સુરત C) અમદાવાદ D) રાજકોટ
48. નીચેનામાંથી ક્યા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી ?
A) રાજસ્થાન B) મહારાષ્ટ્ર C) મધ્યપ્રદેશ D) છત્તીસગઢ
49. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે ?
A) 31 B) 32 C) 33 D) 34
50. ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે ?
A) કર્કવૃત્ત B) મકરવૃત્ત
C) વિષુવવૃત્ત D) ઉપરમાંથી કોઈ નહી.
51. પાલીતાણાના જૈન મંદિરો ક્યા પર્વત પર આવેલા છે ?
A) ગિરનાર B) શેત્રુંજય
C) પાવાગઢ D) વિલ્સન હિલ
52. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
A) અરવલ્લી B) સહ્યાદ્રી C) પશ્ચિમઘાટ D) પૂર્વઘાટ

બિન સચિવાલય ક્લાર્ક - 2016

53. અમદાવાદ જિલ્લામાં સાત નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે.આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ?
A) સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક
B) માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી
C) શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી
D) હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી
54. ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી 'કાઉસેંચરી' શરૂ કરવાનો નિર્ણય કર્યો ?
A) અમરેલી B) પોરબંદર
C) દેવભૂમિ -દ્વારકા D) મોરબી

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

55. જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે ?
A) દાંતા અને પાલનપુર B) બોટાદ અને ગઢડા
C) ગાંધીનગર - વિસનગર D) તળાજા - સાળંગપુર
56. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ?
A) વાત્રક B) મહી C) તાપી D) બનાસ
57. કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે?
A) જીપ્સમ B) લિગ્નાઈટ કોલસો
C) ડાયનાસોરના અવશેષો D) અશુદ્ધ લોખંડ
58. કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ?
A) ઉત્તર ગુજરાત B) દક્ષિણ ગુજરાત
C) મધ્ય ગુજરાત D) પસાર થતું નથી
59. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે?
A) જિપ્સમ B) યૂરિયા C) એમોનિયા D) લાઈમ

GPSC પ્રિલિમ - 2001

60. આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે.
A) સુરત B) થાન C) મોરબી D) વાંકાનેર
61. સરકા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે ?
A) નર્મદા B) સાબરમતી C) તાપી D) મહી
62. "એનરોન પ્રોજેક્ટ" શાના માટે છે ?
A) વીજળી પાવર ઉત્પાદન B) ધરતીકંપ પછી પુનઃ વસવાટ
C) અનાથ બાળકો D) નહેર યોજના
63. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે ?
A) તાપી B) સાબરમતી C) નર્મદા D) મહી
64. નળસરોવર અહીં આવેલું છે ?
A) ચરોતર B) ભાલપ્રદેશ C) કચ્છ D) આહવા

GPSC પ્રિલિમ - 2007

65. બાલારામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
A) મહેસાણા B) સાબરકાંઠા C) બનાસકાંઠા D) પંચમહાલ
66. નીચેનામાંથી ગુજરાતનું ક્યું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?
A) ભરૂચ B) ઓખા C) ખંભાત D) ભાવનગર
67. વેળાવદરનું અભિયારણ શાના માટે જાણીતું છે ?
A) કાળિયાર B) સુરખાબ C) સિંહ D) ઘુડખર
68. બનાસ નદીનું ઉદ્દભવસ્થાન ક્યાં છે ?
A) મધ્યપ્રદેશ B) રાજસ્થાન C) ગુજરાત D) હરિયાણા
69. સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે ?
A) સુરત B) જામનગર C) વિરમગામ D) વડોદરા
70. મરીન નેશનલ પાર્ક ક્યા ટાપુ પર આવેલો છે ?
A) પિરમ B) બેટ દ્વારકા C) પિરોટન D) છાડ બેટ
71. કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ?
A) જૂનાગઢ B) કચ્છ C) ડાંગ D) ભાવનગર
72. સંખેડા શાના માટે વખણાય છે ?
A) શંખની વસ્તુઓ માટે B) સાડીઓ
C) ફર્નિચર D) રમકડા

45)A, 46)C, 47)C, 48)D, 49)C, 50)D, 51)B, 52)A, 53)A, 54)B, 55)A, 56)D, 57)B, 58)A, 59)D, 60)C, 61)D, 62)A, 63)C, 64)B, 65)C, 66)A, 67)A, 68)B, 69)D, 70)C, 71)B, 72)C.

GPSC પ્રિલિમ - 2014

73. નીચે દર્શાવેલ ક્યા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ?
A) ભુજથી દ્વારકા B) વલસાડથી ભુજ
C) કંડલાથી સાપુતારા D) સાપુતારાથી દ્વારકા

74. જૂન - 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે?
A) 121.92 મીટરથી 138.68 મીટર
B) 131.64 મીટરથી 141.92 મીટર
C) 110.64 મીટરથી 121.92 મીટર
D) 363 મીટરથી 400 મીટર

75. ગુજરાતનો વિસ્તાર (અક્ષાંશ - રેખાંશ) સંબંધમાં નીચેના પૈકી ક્યો જવાબ સાચો છે ?
A) અરબ સાગરના કિનારે 28°,30' ઉત્તર અક્ષાંશવૃત્તથી 36°, 66' ઉત્તર અક્ષાંશવૃત સુધી.
B) પૂર્વ રેખાંશવૃત્ત 52°,40'થી પૂર્વ રેખાંશવૃત 57°,36' વચ્ચેનો વિસ્તાર.
C) અરબ સાગરના કિનારે 20°,06' ઉત્તર અક્ષાંશવૃત્તથી 24°,42' ઉત્તર અક્ષાંશવૃત સુધી.
D) પૂર્વ રેખાંશવૃત્ત 75°,20'થી પૂર્વ રેખાંશવૃત્ત 98°,76' વચ્ચેનો વિસ્તાર.

76. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર .... ચો. કિ.મી. છે અને તે પૂરાં દેશના વિસ્તારના ....% વિસ્તાર છે.
A) 1.96 લાખ ચો. કિ.મી. અને 6.19%
B) 2.96 લાખ ચો. કિ.મી. અને 13.9%
C) 80900 લાખ ચો. કિ.મી. અને 6.19%
D) 1.56 લાખ ચો. કિ.મી. અને 18.40%

77. ગુજરાત રાજ્યના ક્યા પ્રદેશને 'સોનેરી પાનનો મુલક' પણ કહે છે?
A) ચરોતર B) કચ્છ
C) દક્ષિણ ગુજરાત D) સૌરાષ્ટ્ર

78. ગિફ્ટ સિટીમાં 'GIFT' એટલે શું ?
A) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી, ગાંધીનગર જિલ્લો
B) ગવર્નમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો
C) ગુજરાત ઈન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો
D) ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો

79. ક્યા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે?
A) કોસ્ટિક સોડા B) સોડા એશ
C) સલ્ફ્યુરિક એસિડ D) નાઈટ્રિક એસિડ

80. નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયુ વૃક્ષ આરક્ષિત (Reserved) નથી?
A) ખેર B) ટીમરૂ C) સાગ D) ચંદન

PSI ખાતાકીય - 23/04/2017

81. ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) ગાંધીનગર B) જૂનાગઢ C) દાહોદ D) પંચમહાલ

82. ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર ક્યા જિલ્લામાં આવેલું છે?
A) બોટાદ B) સુરેન્દ્રનગર C) અમરેલી D) ભાવનગર

83. ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) ભરૂચ B) નર્મદા C) તાપી D) વલસાડ

84. સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
A) તાપી B) ગાંધીનગર C) મહેસાણા D) બનાસકાંઠા

85. ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
A) સુરેન્દ્રનગર B) રાજકોટ C) જામનગર D) બોટાદ

86. નીચેનામાંથી ક્યા માસમાં રવિઋતુનો પાક થાય છે ?
A) જાન્યુઆરીથી માર્ચ B) મે થી જુલાઈ
C) જૂનથી ઓગસ્ટ D) એકપણ નહી

87. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) મોરબી B) જૂનાગઢ
C) ભાવનગર D) દેવભૂમિ દ્વારકા

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

88. 'કાથો' ક્યા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે?
A) ખાખરો B) ખેર C) કરંજ D) સાદડ

89. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડિઝલ' મેળવવામાં આવે છે?
A) ભીલાવા B) બીલી C) રતનજોત D) લીમડો

90. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દૃષ્ટિએ ક્યા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે?
A) ડાંગ B) નર્મદા C) જૂનાગઢ D) તાપી

91. ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ (Very dense forest cover) ધરાવતો કયો જિલ્લો છે?
A) ડાંગ B) જૂનાગઢ C) તાપી D) નર્મદા

92. પરવાળા (કોરલ) ક્યા અભયારણ્યમાં જોવા મળે છે?
A) નળ સરોવર પક્ષી અભયારણ્ય
B) દરિયાઈ અભયારણ્ય
C) થોળ અભયારણ્ય
D) નારાયણ સરોવર અભયારણ્ય

93. ખડમોર પક્ષી ક્યા રાષ્ટ્રીય ઉદ્યાન/અભયારણ્યમાં જોવા મળે છે?
A) વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન
B) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
C) નળ સરોવર પક્ષી અભયારણ્ય
D) થોળ અભયારણ્ય

73)D, 74)A, 75)C, 76)A, 77)A, 78)A, 79)B, 80)B, 81)B, 82)D, 83)C, 84)D, 85)D, 86)A, 87)C, 88)B, 89)C, 90)A, 91)A, 92)B, 93)A.

94. ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે?
A)ટર્પેન્ટાઈન B)સાબુદાણા C)લાખ D)નેતર

95. ગુજરાતમાં સૌથી પ્રથમ સુર્યોદય ક્યા જિલ્લામાં થાય છે?
A)દાહોદ B)સાબરકાંઠા C)અરવલ્લી D)છોટા ઉદેપુર

PSI/ASI GK - 2/5/2015

96. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?
A)મેશ્વો B)બનાસ C)હાથમતી D)મહી

97. 'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ?
A)ચોરવાડ B)ભરૂચ C)ભાવનગર D)સુરત

98. વૌઠા શેના માટે જાણીતું છે ?
A)ચાર નદીના સંગમ માટે B)સાત નદીના સંગમ માટે
C)પાંચ નદીના સંગમ માટે D)હવા ખાવાના સ્થળ માટે

99. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ?
A)વડોદરા B)આણંદ C)સુરત D)મહેસાણા

100. ઈફકો (IFFCO) શેના માટે પ્રખ્યાત છે ?
A)રાસાયણિક ખાતર માટે B)રેશમી કાપડ માટે
C)દૂધની બનાવટ માટે D)બાયોલોજીકલ વેસ્ટ માટે

101. ભારતની ભૂમિનો 6 % ભાગ ક્યું રાજ્ય રોકે છે ?
A)ગોવા B)ગુજરાત C)મહારાષ્ટ્ર D)રાજસ્થાન

102. ખારાઘોડા શું છે ?
A)ઘોડાની જાત છે B)મીઠાની જાત છે
C)સ્થળનું નામ છે D)આમાનું કોઈ નથી

103. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
A)1500 કિલોમીટર B)1600 કિલોમીટર
C)1700 કિલોમીટર D)2200 કિલોમીટર

104. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ?
A)હિરણ-ભોગાવો B)ઓરસંગ-મહિ
C)મહિ-રેવા D)વાત્રક-શેઢી

105. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
A)એરંડા B)રાય C)તલ D)તમાકુ

106. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
A)ભાદર B)ભોગાવો C)આજી D)મોજ

107. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઈ ટેકરીઓ આવેલી છે ?
A)આરાસુરની B)માંડવીની C)ગીરની D)જૈસોરની

108. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે.
A)82 સે.મી. B)81 સે.મી. C)80 સે.મી. D)83 સે.મી.

GPSC Class-1 - 2016

109. વસ્તીગણત્રી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ?
A)318 B)308 C)328 D)338

110. વસ્તીગણત્રી - 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે?
A)72 % B)74 % C)76 % D)78 %

111. ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી ક્યા સ્થળે મળી આવ્યા છે ?
A)આંબા ડુંગર B)ડુંગરગામ C)નૌતિટોકરી D)ઉપરના તમામ

112. રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ?
A)ચેરના વૃક્ષો B)મેન્ગ્રોવ C)રતનજ્યોત D)ગાંડા બાવળ

113. અલિયાબેટ કઈ નદીના મુખપ્રદેશમાં આવેલો છે ?
A)તાપી B)મહી C)નર્મદા D)સાબરમતી

114. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિ.મી. પહોળો છે, જેને ક્યા નામે ઓળખાય છે ?
A)ખંભાતની ખાડી B)કોપાલાની ખાડી
C)સાબરમતીની ખાડી D)સુવાલીની ખાડી

115. નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે?
A)120 કિ.મી. B)140 કિ.મી. C)160 કિ.મી. D)180 કિ.મી.

116. ગુજરાતનું ક્યું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ?
A)ઊંઝા B)ડીસા C)સાયલા D)અબડાસા

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

117. ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે?
A)73 અને 78 B)78 અને 73 C)63 અને 68 D)68 અને 63

118. ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર (Literacy Rate) સૌથી વધારે છે?
A)બનાસકાંઠા B)સુરત C)મહેસાણા D)અમદાવાદ

119. ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011 ના સેન્સેસમાં દર્શાવવામાં આવેલ છે?
A)41 B)42 C)43 D)44

120. ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં 25 થી 59 વય જૂથ ધરાવતાં લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ)
A)41.1 અને 43.5 B)43.5 અને 41.1
C)46.4 અને 43.5 D)43.5 અને 46.4

121. ગુજરાત રાજયમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે?
A)GSFC B)GWRDC C)GMDC D)GIIC

122. સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ અને તેનાં મુખ્ય મથકોને યોગ્ય રીતે જોડો.

1) CEPT	A)આણંદ
2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ	B)વડોદરા
3) GETRI	C)ભાવનગર
4) IRMA	D)અમદાવાદ

A)1-B, 2-A, 3-D, 4-C B)1-C, 2-B, 3-A, 4-D
C)1-D, 2-C, 3-B, 4-A D)1-A, 2-D, 3-C, 4-B

94)A, 95)A, 96)B, 97)A, 98)B, 99)B, 100)A, 101)B, 102)C, 103)B, 104)C, 105)A, 106)A, 107)D, 108)D, 109)B, 110)D, 111)D, 112)D, 113)C, 114)B, 115)A, 116)C, 117)A, 118)B, 119)A, 120)A, 121)B, 122)C.

GPSC Class - 2 - 29/1/2017

123. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

A)નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓનિયન એન્ડ ગાર્લિક	1) સૂરત
B)સેન્ટ્રલ કેટલ બ્રિડીંગ ફાર્મ	2) ભાવનગર
C)સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ	3) બોરિયાળી
D)નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ	4) ગોધરા

A) A-2, B-1, C-3, D-4 B) A-3, B-2, C-4, D-1
C) A-4, B-1, C-2, D-3 D) A-1, B-3, C-2, D-4

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

124. ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલીયમ લી.દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રીફાઈનરી કયાં આવેલી છે?
A)ગુવાહાટી B)જામનગર C)મુંબઈ D)ચેન્નાઈ

125. ભારતનાં સૌથી જૂના પર્વતો કયા છે?
A)અરવલ્લી B)વિન્ધ્યા C)સાતપુડા D)નીલગીરી

126. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
A)સુરેન્દ્રનગર B)કચ્છ C)ભાવનગર D)જૂનાગઢ

127. દુનિયામાં ભાગ્યે જ મળતું ફુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયાં જિલ્લામાં મળી આવે છે?
A)બનાસકાંઠા B)કચ્છ C)ખેડા D)જામનગર

128. ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
A)રાજકોટ B)બનાસકાંઠા C)અમરેલી D)જૂનાગઢ

129. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે?
A)અરવલ્લી B)વિધ્યં C)સાતપૂડા D)કલમુર

130. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
A)1965 B)1966 C)1967 D)1968

131. સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી.પી.સી.એલ. એ ટેકનીકલ દષ્ટિએ શકયતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે?
A)તિથલ (વલસાડ)નો દરિયો
B)માંડવી પાસે કચ્છનો અખાત
C)કંડલા બંદર
D)સોમનાથનો દરિયા કાંઠો

132. ગુજરાતનો ક્યો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે?
A)ઊંઝા B)ચરોતર C)રાજકોટ D)ભરૂચ

GPSC Class - 2 - 18/12/2016

133. નીચેનામાંથી ક્યું જોડકુ ખોટું છે?
A)સુરખાબ અભ્યારણ્ય - કચ્છ
B)ઘુડખર અભ્યારણ્ય - જામનગર
C)રતનમહાલ અભ્યારણ્ય - દાહોદ
D)ગીર અભ્યારણ્ય - ગીર સોમનાથ

134. ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી?
A)પ્રથમ જીવયુગ B)દ્વિતિય જીવયુગ
C)તૃતિય જીવયુગ D)ચતુર્થ જીવયુગ

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

135. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ.ના સંયુકત સાહત દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામા આવ્યું છે?
A)હજીરા B)બેડી C)દહેજ D)પીપાવાવ

136. ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે?
A)નર્મદા B)સાબરમતી C)તાપી D)મહી

137. રાજયની આવકના અંદાજો તૈયાર કરવા માટેના પાયાનું વર્ષ તરીકે કયું વર્ષ ગણતરીમાં લેવામાં આવે છે?
A)2004-05 B)2000-01 C)2011-12 D)1951-52

138. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજયમાં વસ્તીની ગીચતા પ્રતિ ચો.કિ. કેટલી છે?
A)282 B)407 C)308 D)300

139. દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટીકલ્સ પ્રોડકટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે?
A)20% B)45% C)60% D)75%

140. ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે?
A)ઓખા B)બેડી C)વેરાવળ D)અલંગ

141. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે?
A)ચરોતર B)ખાખરીયા ટપ્પા C)દસક્રોઈ D)કાનમ

142. કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે?
A)ખેરના વૃક્ષો B)ચારોબીના વૃક્ષો
C)શંખાવલી વનસ્પતિ D)ગુગળના વૃક્ષો

143. મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે?
A)લોખંડ B)ખાંડ C)ડેરી D)વનસ્પતિ તેલ

144. રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વિગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે?
A)ભાવનગર B)સુરેન્દ્રનગર C)પાટણ D)પોરબંદર

123)C, 124)B, 125)A, 126)B, 127)A, 128)D, 129)C, 130)A, 131)B, 132)B, 133)B, 134)A, 135)C, 136)A, 137)C, 138)C, 139)B, 140)C, 141)B, 142)A, 143)B, 144)A.

145. ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે?
A)ગિરનારની ટેકરીઓ B)બરડાની ટેકરીઓ
C)અલેકની ટેકરીઓ D)અલેચની ટેકરીઓ

146. ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ક્યા જિલ્લામાં થાય છે?
A)દાહોદ B)સુરેન્દ્રનગર C)બનાસકાંઠા D)ખેડા

147. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે?
A)900 સ્ત્રી : 1000 પુરૂષ B) 982 સ્ત્રી : 1000 પુરૂષ
C)919 સ્ત્રી : 1000 પુરૂષ D)928 સ્ત્રી : 1000 પુરૂષ

148. ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે?
A)કચ્છ B)સૌરાષ્ટ્ર
C)ઉત્તર ગુજરાત D)દક્ષિણ ગુજરાત

149. ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે?
A)સાણંદ B)બહુચરાજી C)હાલોલ D)અંકલેશ્વર

150. સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?
A)બારડોલી B)વલસાડ C)ચીખલી D)નવસારી

151. નીચેના પૈકી ક્યા રાજયમાંથી કર્કવૃત્ત પસાર થાય છે?
A)ગુજરાત B)રાજસ્થાન C)કેરળ D)તામિલનાડુ

152. ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે?
A)તાપી B)સાબરમતી
C)મહી D)ઉપરના પૈકી કોઈ નહી

GPSC Class - 2 - 12/2/2017

153. ખડક (ROCK) નાં મુખ્ય કેટલાં પ્રકારો છે?
A)3 B)4 C)5 D)6

154. 2011 ના સેન્સસ મુજબ, કુલ વસ્તીના પ્રમાણમાં 0-6 વર્ષની વય જૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાત રાજયમાં છે?
A)13.6 અને 12.9 B) 12.9 અને 13.6
C) 13.8 અને 13.1 D) 14.7 અને 14.2

155. ઈફક્કોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે?
A)વડોદરા, જામનગર B) કલોલ, કંડલા
C)જૂનાગઢ, ભાવનગર D)મુંદ્રા, વલસાડ

156. "GIFT CITY" ક્યાં હેતુથી બનાવવામાં આવેલ છે?
A)નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે
B)આનંદ પ્રમોદ માટે
C)પ્રવાસન સ્થળ તરીકે D)ઉત્પાદન કાર્ય કરવા માટે

157. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટુંકા ગાળાની નાણાંની જોગવાઈ પુરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે?
A)બે B)ત્રણ C)ચાર D)એક

GPSC Class - 2 - 28/1/2017

158. શુન્ય થી 6 વર્ષના સુધીના બાળકોમાં સેકસ રેશીયો (Sex Ratio) ભારત અને ગુજરાતમાં કેટલો છે?
A)919 અને 890 B) 890 અને 919
C)914 અને 923 D)923 અને 914

159. નીચેનામાંથી કોને તળાવ/કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય?
A)કરચલા (Crab) B)ડોગ ફીશ (Dog Fish)
C)ગમબુશીયા (Gambusia Fish) D)ગોકળગાય (Snail)

GPSC Class-1 - 15/01/2017

160. ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે?
A)કાળી જમીન B)પડખાઉ જમીન
C)કાંપની જમીન D)રાતી જમીન

161. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજય પ્રથમ ક્રમે છે?
A)ઉત્તરપ્રદેશ B)મહારાષ્ટ્ર C)રાજસ્થાન D)ગુજરાત

162. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જીલ્લામાં 1000 પુરુષ દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે?
A)ગાંધીનગર B)આણંદ C)ભરૂચ D)સુરત

GPSC Class-1 - 15/01/2017

163. ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળ ગ્રામ .... ?
A)રાયસણ B)બોપિકા C)સરગાસણ D)સુઘડ

164. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર .... ચોરસ કિ.મી. છે.
A)1.56 લાખ ચો. કિ.મી. B) 1.96 લાખ ચો. કિ.મી.
C)2.96 લાખ ચો. કિ.મી. D) 80900 લાખ ચો. કિ.મી.

165. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં વિસ્તારમાં નોંધાય છે ?
A)ઉત્તર ગુજરાત B)દક્ષિણ ગુજરાત
C)સૌરાષ્ટ્ર D)કચ્છ

166. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ?
A)માંડવી B)સુરત C)ઓખા D)અલંગ

167. ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ?
A)પ્રથમ B)બીજો C)ત્રીજો D)ચોથો

168. ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ?
A)અંબાજી B)શામળાજી C)વલસાડ D)પાટણ

169. ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યા સ્થળેથી મળી આવ્યું ?
A)અંકલેશ્વર B)હઝીરા C)મુંદ્રા D)લુણેજ

145)A, 146)C, 147)C, 148)C, 149)C, 150)A, 151)A, 152)A, 153)A, 154)A, 155)B, 156)A, 157)B, 158)A, 159)C, 160)C, 161)D, 162)D, 163)A, 164)B, 165)D, 166)D, 167)C, 168)B, 169)D.

170. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
A) કર્કવૃત્ત B) મકરવૃત
C) વિષુવવૃત્ત D) આમાનું કોઈપણ નહીં

171. ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ?
A) ઓખા B) અમરેલી C) પોરબંદર D) વેરાવળ

172. તાપીની દક્ષિણે .... પર્વતમાળા શરૂ થાય છે.
A) સહ્યાદ્રિ B) અરાવલી C) સાતપુડા D) ગિરિમાળા

173. નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ?
A) બનાસ B) સાબરમતી C) મીંઢાળા D) તાપી

174. ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A) ડીસા B) નવસારી C) જૂનાગઢ D) ભાવનગર

175. ક્યા વિહારધામને દરિયા કિનારો નથી ?
A) અહમદપુર માંડવી B) ઉભરાટ
C) નારગોલ D) સાપુતારા

176. ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ક્યો છે ?
A) ઉત્તર ગુજરાત B) સૌરાષ્ટ્ર
C) મધ્ય ગુજરાત D) કચ્છ

177. આરસપહાણના પત્થર ગુજરાતના ક્યા વિસ્તારમાં વધુ મળે છે?
A) બનાસકાંઠા B) ખેડા C) વલસાડ D) સાબરકાંઠા

178. ક્યો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે?
A) અમદાવાદ B) રાજકોટ C) કચ્છ D) સુરત

179. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
A) રૂપેણ B) બનાસ C) સરસ્વતી D) ચાનમ

180. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યા જિલ્લામાં થાય છે?
A) બનાસકાંઠા B) અમરેલી C) ભાવનગર D) સુરેન્દ્રનગર

181. વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) ક્યા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે ?
A) ડાંગ B) દાહોદ C) સુરત D) તાપી

182. ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે ?
A) 10 B) 5 C) 13 D) 14

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

183. ગુજરાતમાં મેન્ગુર્વ જંગલો મુખ્યત્વે ક્યાં છે ?
A) રાજકોટ, સુરેન્દ્રનગર B) જુનાગઢ, નવસારી
C) જામનગર, કચ્છ D) વડોદરા, દાહોદ

184. શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?
A) વડોદરા, પંચમહાલ, દાહોદ
B) કચ્છ, ભરૂચ, ભાવનગર
C) જામનગર, જૂનાગઢ, અમરેલી
D) મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર

185. ડોલોમાઈટ અને લિગ્નાઈટ કોલસો ક્યાં મળી આવે છે ?
A) કચ્છ B) વડોદરા C) રાજકોટ D) જામનગર

186. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ?
A) ચરોતર B) સાબરકાંઠા C) જૂનાગઢ D) ભરુચ

187. મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો ક્યા નામે ઓળખાય છે ?
A) સુવાલીની ટેકરીઓ B) કોપાલીની ટેકરીઓ
C) ચરોતરની ટેકરીઓ D) ચાડવા ડુંગરધાર

188. "ખારો", "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ?
A) શેરડીના ઉત્પાદન B) રણપ્રદેશ
C) રણના ઉત્પાદન D) કચ્છીફરસાણ

189. "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી ક્યાં મેદાનોમાં સમાવેશ થાય છે?
A) વીરમગામનું મેદાન
B) અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ
C) ચરોતરના પૂર્વનું મેદાન
D) ઢાઢરનું મેદાન

190. નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે ક્યા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ?
A) ખોખરાનો ડુંગર B) પોલોના જંગલો
C) માતાના મઢ D) સહ્યાદ્રિ પર્વતમાળા

191. વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વિગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ?
A) 4 B) 5 C) 6 D) 7

192. ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર ક્યા જિલ્લામાં આવેલો છે ?
A) વલસાડ B) જૂનાગઢ C) કચ્છ D) સુરેન્દ્રનગર

193. દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત ક્યું સ્થાન ધરાવે છે ?
A) પ્રથમ B) બીજું C) ત્રીજું D) ચોથું

194. વાંસદા અભ્યારણ્યમાં ક્યા મહત્ત્વના વન્યજીવો જોવા મળે છે?
A) રીંછ B) સુરખાબ
C) હરણ અને ચિંકારા D) દિપડા અને ચૌશિંગા

195. ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે?
A) ડાંગ B) પાટણ C) ધોળકા D) પોરબંદર

GPSC Class - 2 - 16/04/2017

196. ગુજરાત રાજ્યનાં ઉદ્યોગો સંબંધે કયુ વાક્ય સાચું નથી
1) 30 પેટ્રોકેમીકલ અને 50 કેમીકલ; દવાનું ઉત્પાદન અત્રે થાય છે.
2) હીરા ઘસવા, ઘરેણા બનાવવા વગેરેમાં રાજ્ય અવલ્લ નંબર છે.
3) કપાસ ઉત્પાદન અને નિકાસમાં પ્રથમ નંબર છે.
4) ''ડેનીમ''ના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા નંબરે છે.
A) 1 અને 2 B) 2 અને 3
C) 3 અને 4 D) બધા જ વાક્યો સાચાં છે

170)D, 171)D, 172)A, 173)A, 174)A, 175)D, 176)C, 177)A, 178)C, 179)B, 180)C, 181)D, 182)C, 183)C, 184)B, 185)A, 186)C, 187)A, 188)B, 189)B, 190)C, 191)D, 192)C, 193)A, 194)D, 195)B, 196)D.

197. શૈક્ષણિક સંસ્થાઓ અને તેના મુખ્ય મથકને યોગ્ય રીતે ગોઠવો.
1) ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU) A) સુરત
2) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાઈન (NID) B) અમદાવાદ
3) સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી C) આણંદ
4) 'ઈરમા' (IRMA) D) ગાંધીનગર
A) 1-D, 2-B, 3-A, 4-C B) 1-B, 2-A, 3-C, 4-D
C) 1-A, 2-C, 3-D, 4-B D) 1-C, 2-D, 3-B, 4-A

198. "ઈન્ડિયા આઈ.એન.એક્સ""INDIA INX" કે જેનું ઉદ્ઘાટન મા.વડાપ્રધાનશ્રીએ કરેલ છે, તે કયા શહેરમાં આવેલ છે?
A) હૈદરાબાદ B) ગિફ્ટ સીટી ગાંધીનગર
C) કલકત્તા D) મુંબઈ

199. ઓ પી.એ.એલ. (OPAL) પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે?
A) દહેજ B) જામનગર C) કોચીન D) હલ્દીયા

200. ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકુ સાચુ નથી?
A) સીદ્દી સૈયદની જાળી - અમદાવાદ
B) પુનીત વન (વનસ્પતિ બાગ) ગાંધીનગર
C) સુદામા મંદિર - પોરબંદર
D) રાણ કી વાવ - પાટણ
A) 1 અને 2 B) 2 અને 3
C) 3 અને 4 D) ઉપરોક્ત બધા જ જોડકા સાચાં છે.

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

201. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
A) જૂનાગઢ B) પોરબંદર
C) અમરેલી D) ગીર-સોમનાથ

202. ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ?
A) ભાલ B) ચરોતર C) કાનમ D) હાલાર

203. ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ?
A) કોયલી B) અંકલેશ્વર
C) કલોલ D) ખંભાત પાસે લુણેજ

204. ફલોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ?
A) ત્રીજા B) બીજા C) પ્રથમ D) પાંચમા

205. ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
A) અમદાવાદ B) મહેસાણા C) જુનાગઢ D) સાબરકાંઠા

206. બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ?
A) ગ્રેફાઈટ B) બેન્ટોનાઈટ C) વુલેસ્ટોનાઈટ D) કેલ્સાઈટ

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

207. ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) લખોટા ફોર્ટ A) સુરત
2) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા
3) તારંગા ફોર્ટ C) જુનાગઢ
4) ઓલ્ડ ફોર્ટ D) જામનગર
A) 1-C, 2-B, 3-A, 4-D B) 1-D, 2-C, 3-B, 4-A
C) 1-B, 2-A, 3-D, 4-C D) 1-A, 2-D, 3-C, 4-B

208. ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ?
1) ગીર સોમનાથ - વેરાવળ
2) તાપી - વ્યારા
3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા
4) મહીસાગર - લુણાવાડા
5) સાબરકાંઠા - હિંમતનગર
A) 1 અને 2 B) 2 અને 3
C) 3, 4 અને 5 D) બધા જ જોડકા સાચા છે.

209. ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
1) ગિરનાર A) ડાંગ
2) સાપુતારા B) જૂનાગઢ
3) પાવાગઢ C) કચ્છ
4) ધીણોધર D) પંચમહાલ
A) 1-A, 2-D, 3-C, 4-B B) 1-B, 2-A, 3-D, 4-C
C) 1-D, 2-C, 3-B, 4-A D) 1-C, 2-B, 3-A, 4-D

210. નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
1) મચ્છુ - વાંકાનેર
2) હાથમતી - હિંમતનગર
3) પૂર્ણા - નવસારી
4) તાપી - વડોદરા
A) 1 B) 4 C) 3 D) 2

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

211. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે?
A) પંચમહાલ B) બનાસ કાંઠા C) રાજકોટ D) પોરબંદર

212. ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતુ થયું છે?
A) ધોલેરા B) કંડલા C) દહેજ D) પીપાવાવ

213. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે?
A) કંડલા, કચ્છ B) માંડવી, કચ્છ
C) સચાણાં, જામનગર D) ચોરવાડ, જૂનાગઢ

197)A, 198)B, 199)A, 200)D, 201)A, 202)C, 203)D, 204)C, 205)A, 206)C, 207)B, 208)D, 209)B, 210)B, 211)A, 212)D, 213)C.

214. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તાર માં જોવાં મળે છે?
A)નળસરોવર B)વેળાવદર
C)પીરોટન ટાપુઓ D)કચ્છ

215. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?
A)કચ્છ B)બનાસકાંઠા C)સાબરકાંઠા D)પાટણ

216. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે?
A)ગિરનાર B)દાતાર C)તારંગા D)ચોટીલા

217. વુલેસ્ટોનાઈટ ખનીજ કયાં ઉદ્યોગમાં વપરાય છે?
A)વાસણ ઉદ્યોગ B)ટાઈલ્સ ઉદ્યોગ
C)ઉન ઉદ્યોગ D)મોબાઈલ ફોન ઉદ્યોગ

218. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે?
A)મોખડી ઘાટ B)હાંફેશ્વર C)નાંદોદ D)હરણફાળ

219. કયાં સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે?
A)મિયાણી B)રાજસ્થળી C)ગોમટા D)આડેસર

220. પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા"લોએસ"ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો કયા જોવા મળે છે?
A)ઉત્તર ગુજરાત B)ગીરના જંગલો
C)તાપીથી વાપી વચ્ચે D)પૂર્વ પટ્ટીમાં

221. ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતુ હતું?
A)ભાવનગર B)અંજાર C)ખંભાત D)રાજકોટ

222. નીચેના પૈકી કયું વૈજ્ઞાનિક નગર નથી?
A)અંકલેશ્વર B)અંજાર C)જૂનાગઢ D)મુંદ્રા

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

223. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
A)સાબરમતી B)સરસ્વતી C)પુષ્પાવતી D)બનાસ

224. વસ્તી ગણતરી -2011 પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે?
A)57.4% B)48% C)42.6% D)52%

225. કચ્છની ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે?
A)પ્રસ્તર B)અગ્નિકૃત C)જલનિર્મિત D)વિકૃત

226. કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે?
A)શેઢી અને મહી B)નર્મદા અને ઢાઢર
C)વાત્રક અને સાબરમતી D)સાબરમતી અને કંઠી

227. ભારતમાં નીચેના પૈકી કયુ રાજય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે?
A)આંધ્રપ્રદેશ B)મહારાષ્ટ્ર C)ગુજરાત D)કર્ણાટક

228. સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને કયાં નામથી ઓળખવામાં આવે છે?
A)તળાવ B)બંધારા C)લગૂન D)ખાડી

229. 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે?
A)09.38% B)19.38% C)29.38% D)39.38%

230. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે?
A)ડાંગ B)તાપી C)દાહોદ D)નર્મદા

231. ગુજરાતની શહેરી વસ્તીમાં સરાસરી સાક્ષરતા દર કેટલો છે?
A)66.31% B)76.31% C)86.31% D)96.31%

232. પાણીયા વન્યજીવન અભ્યારણમાં આવેલું છે?
A)જૂનાગઢ B)ભાવનગર C)અમરેલી D)પોરબંદર

GPSC Class - 2 - 18/03/2017

233. ગુજરાત રાજયની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ)
A)42.60 B)24.60 C)64.20 D)52.60

234. ગુજરાત રાજયમાં ગ્રામ્ય વિસ્તારમાં લીટરસી રેટ (Literacy rate) કેટલો છે?
A)78.00 B)71.70 C)86.30 D)73.00

235. દેશમાં કોલસાથી વિજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલ છે. તે એકમો કયા સ્થળે આવેલા છે?
A)મુંદ્રા B)સાબરમતી (અમદાવાદ)
C)વડોદરા D)સુરત

GPSC Class - 1 - 28/01/2017

236. ગુજરાત રાજય કેટલા અક્ષાંશમાં આવેલું છે?
A)20.1 થી 24.3 ઉ.અ. B)20.1 થી 24.7 ઉ.અ.
C)20.1 થી 25.4 ઉ.અ. D)70.4 પૂર્વ અક્ષાંશવૃત્ત

237. ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરીમાળાના ડુંગરો આવેલા છે?
A)સાપુતારા B)વિધ્યાંચલ
C)અરવલ્લી D)ઉપર પૈકી એકપણ નહી

238. ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે?
A)સુમુલ B)અમૂલ C)બનાસ D)દૂધસાગર

239. ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત કયાં આવેલી છે?
A)ભરૂચ B)અંકલેશ્વર C)સુરત D)વડોદરા

240. કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે?
A)ભૂજ B)અંજાર C)મુંદ્રા D)અબડાસા

214)D, 215)A, 216)D, 217)B, 218)D, 219)B, 220)A, 221)C, 222)D, 223)C, 224)C, 225)B, 226)A, 227)C, 228)C, 229)B, 230)C, 231)C, 232)C, 233)A, 234)B, 235)A, 236)B, 237)C, 238)B, 239)B, 240)C.

241. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલ ચાર શહેરોમાં વસ્તીગીચતામાં (એક ચોરસ કિલોમીટર પ્રમાણ) પ્રથમ ક્રમે કયા શહેરનો સમાવેશ થાય છે?

A)અમદાવાદ B)આણંદ C)સુરત D)ગાંધીનગર

242. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?

A)916 B)947 C)940 D)918

243. વર્ષ 2011 ની વસ્તી ગણતરી અનુસાર દર હજાર પુરુષની સામે નીચે દર્શાવેલ કયા જિલ્લામાં સ્ત્રીઓનું પ્રમાણ એક હજારથી વધુ છે?

A)દાહોદ B)તાપી C)રાજકોટ D)નર્મદા

244. નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે?

A)કલકલિયો B)ચિલોગો C)કબૂતર D)સુરખાબ

નાયબ ચિટનીશ - 02/06/2015

245. ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત કયો છે ?

A)શેત્રુંજી B)ગિરનાર C)સાપુતારા D)પાવાગઢ

246. ગુજરાતની સૌથી લાંબી નદી............છે.

A)નર્મદા B)તાપી C)સાબરમતી D)મહિસાગર

નાયબ ચિટનીશ - 05/02/2017

247. અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

A)કાપડ સંશોધન B)ક્લબ હાઉસ તરીકે
C)જ્વેલરી સંશોધન D)પ્લાસ્ટીક સંશોધન

GPSC Class - 2 - 16/04/2017

248. સને 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ગ્રામ વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે ?

A)81.6 અને 61.4 B)85.8 અને 69.7
C)91.0 અને 81.0 D)77.2 અને 57.7

249. ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ?

A)ખંભાતનો અખાત B)કુનારનો અખાત
C)કેરલા ખાતેના બેક વોટર D)ચિલ્કા સરોવર

250. દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે?

A)વારાણસી B)વડોદરા C)રતલામ D)કલકત્તા

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

251. નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ?

A)ભરૂચ B)ખંભાત C)સુરત D)ઘોઘા

252. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ?

A)7.47 % B)8.47 % C)9.47 % D)10.47 %

253. "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ?

A)ચીકુ B)દાડમ C)જામફળ D)સંતરા

254. તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ?

A)અમરકંટક B)વિંધ્યાચલ C)સહ્યાદ્રિ D)સાતપુડા

GPSC Class - 2 - 12/02/2017

255. ગુજરાત રીફાઈનરીમાં ખનીજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઈપ લાઈન દ્વારા કયાં મોકલવામાં આવે છે?

A)હજીરા (સુરત) B)મથુરા
C)સાબરમતી (અમદાવાદ) D)જામનગર રિલાયન્સ

GPSC Class - 2 - 04/03/2017

256. ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ-પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે?

A)પોરબંદર B)અમદાવાદ C)દ્વારકા D)કચ્છ

257. "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામ ઓળખાય છે ?

A)ચાડવાના ડુંગરો B)લીંચના ડુંગરો
C)બોરઘારના ડુંગરો D)સરકલાના ડુંગરો

258. રતનજ્યોતના બીજમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ?

A)વેરાવળ B)અંકલેશ્વર C)જામનગર D)આજી

GPSC Class - 2 - 18/03/2017

259. આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાંવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઈન્દ્રજંવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના .... વિસ્તારમાં આવેલું છે.

A)અંબાજી B)પંચમહાલ C)વડોદરા D)જુનાગઢ

260. રોઝીબેટ કયા જિલ્લામાં આવેલો છે ?

A)ગીર સોમનાથ B)જામનગર
C)પોરબંદર D)કચ્છ

261. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચુ શિખર .... છે.

A)ઝુરા B)ચોટીલા C)વરાર D)રતનાલ

262. સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે ?

A)સરસ્વતી B)રૂપેણ C)બનાસ D)અર્જુની

241)C, 242)D, 243)B, 244)D, 245)B, 246)C, 247)A, 248)A, 249)A, 250)B, 251)B, 252)B, 253)A, 254)D, 255)C, 256)A, 257)C, 258)D, 259)A, 260)B, 261)B, 262)C.

263. નાઈટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ?

A) પ્રથમ B) બીજો C) ચોથો D) પાંચમો

264. સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક ક્યા બે ડેમ વચ્ચે હશે ?

A) લીમડી ભોગાવોથી રાયડી ડેમ B) મચ્છુ-2 થી સાની ડેમ
C) ધોળાધજા ડેમથી વેણુ ડેમ D) લીમડી ભોગાવોથી હિરણ-2

265. કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ?

A) મહી નદી B) મહા નદી C) ચંબલ નદી D) નર્મદા નદી

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

266. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યા જિલ્લામાં જોવા મળે છે?

A) ડાંગ-વલસાડ B) કચ્છ-પ્રદેશ
C) બનાસકાંઠા D) ધોળકા

267. સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લઈ રહ્યું છે ?

A) 180 B) 182 C) 185 D) 190

268. ગુજરાતમાં ક્યા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે?

A) માંડવી B) જામનગર C) પાટણ D) વડોદરા

269. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ?

A) 8 B) 9 C) 10 D) 12

GPSC Class - 2 - 5/3/2017

270. નીચેના પૈકી ક્યો મોટો ઈરીગેશન પ્રોજેક્ટ (Major irrigation project) ગુજરાતમાં આવેલ નથી ?

A) કાકરા પાર B) પાનમ C) મહી D) ભીમા

271. ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળો, ઈકો-ટુરીઝમ (Eco-Tourism) માટે પ્રખ્યાત છે ?

A) મહાલ (Mahal)
B) કેવડી ફોરેસ્ટ સાઈટ (Kevadi forest site)
C) પીરોટન ટાપુઓ (Pirotan Island)
D) ઉપરોક્ત બધા જ સ્થળો

272. નીચેનાં પૈકી કઈ નદીનું ઉદ્‌ભવસ્થાન અમરકંટક છે ?

A) દામોદર B) મહાનદી C) નર્મદા D) તાપી

273. ધી નેશનલ એકેડમી ઓફ ઈન્ડીયન રેલવે ક્યા સ્થળે આવેલી છે?

A) મસુરી B) પટના C) મુંબઈ D) વડોદરા

GPSC Class - 2 - 11/12/2016

274. રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ? (સને 2011ની વસતી ગણતરીના આધારે)

A) 949 અને 880 B) 943 અને 919
C) 949 અને 919 D) 943 અને 880

275. ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસતી ગણતરી મુજબ કેટલો છે ?

A) 65 અને 68 B) 78 અને 73
C) 73 અને 78 D) 68 અને 65

276. રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?

A) GIPL B) GSFC C) GIL D) GITCO

277. 'જરદોસી' કામ માટે ક્યું શહેર જાણીતું છે ?

A) પાલનપુર B) ખંભાત C) સુરત D) જામનગર

278. ભારતમાં અને ગુજરાતમાં વસતી ગીચતા (પ્રતિ ચોરસ કિલોમીટરે વસતી) સને 2011ના સેન્સસ મુજબ કેટલી છે ?

A) 382 અને 308 B) 308 અને 382
C) 1382 અને 1308 D) 1308 અને 1382

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

279. પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ?

A) નર્મદા B) ભાદર C) સરસ્વતી D) શેઢી

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

280. ગુજરાતમાં તમાકુનો પાક .... વિસ્તારમાં સૌથી વધુ થાય છે.

A) કચ્છ B) ચરોતર C) કાનમ D) સૌરાષ્ટ્ર

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

281. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (ઈન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ?

A) 1979 B) 1960 C) 1995 D) એકેય નહીં

282. નીચેના પૈકી ક્યું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ?

A) રાજસ્થાન B) મહારાષ્ટ્ર C) ગુજરાત D) કર્ણાટક

283. ગુજરાતનો ક્યો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ?

A) મધ્ય ગુજરાત B) દક્ષિણ ગુજરાત
C) ઉત્તર ગુજરાત D) ભાલ વિસ્તાર

263)A, 264)B, 265)A, 266)A, 267)B, 268)D, 269)A, 270)D, 271)D, 272)C, 273)D, 274)A, 275)B, 276)C, 277)C, 278)A, 279)C, 280)B, 281)A, 282)C, 283)A.

284. કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો?
A) ટાઈચુંગ નેટીવ-1 B) આઈ.આર.-8
C) (A) અને (B) બન્ને D) આમાંથી કોઈ નહીં

285. ગુજરાતનાં ક્યા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ?
A) તરઘડીયા B) દાંતીવાડા C) અરણેજ D) આ બધા જ

286. પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં ક્યું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ?
A) જૂનાગઢ B) દાંતીવાડા C) નવસારી D) સુરત

287. નીચેના પૈકી જુવારની ટૂંકાગાળાની કઈ જાત અર્ધસૂકા વિસ્તારો માટે અનુકૂળ છે ?
A) સી.એસ.એચ.-1 B) સી.એસ.એચ.-3
C) (A) અને (B) બન્ને D) આમાંથી કોઈ નહીં

288. નીચેના પૈકી કઈ જાત ચણાની છે ?
A) પુસા ફાલ્ગુની B) ચાફા
C) પુસા વૈશાખી D) વૈશાલી

289. કપાસની કઈ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે ?
A) ગોસીપીયમ આરબોરીયમ B) ગોસીપીયમ બાબડિન્સ
C) ગોસીપીયમ હરબેસીયમ D) ગોસીપીયમ હીરસુટમ

290. ઉકાઈ કાંકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે?
A) દમણગંગા B) ગોદાવરી C) તાપી D) પૂર્ણા

291. શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ ?
A) 50 થી 100 મિલી. B) 50 થી 100 સે.મી.
C) 100 થી 125 સે.મી. D) 125 સે.મી.થી વધારે

292. પીળી પત્તી નીચેનામાંથી ક્યા પાકની જાત છે ?
A) ડુંગળી B) બટાકા C) કોબીજ D) મરચી

293. ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે?
A) તાજમૂળ અવસ્થા B) દુધિયાદાણા અવસ્થા
C) ફૂટ અવસ્થા D) ગાભ અવસ્થા

294. ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ?
A) જમીનમાં પાણી ઉતરવાનું B) જમીનની સખ્તતાઈ
C) નિંદણ D) નિતાર

295. શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ?
A) ચાર B) બે C) છ D) આઠ

296. નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ?
A) ટપક પિયત B) નિક-પાળા પિયત
C) ફુવારા પિયત D) ક્યારા પિયત

297. નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ?
A) જીજી-2 B) જેએલ-24 C) જીજેજી-9 D) જીજી-20

298. 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ?
A) 6.25 B) 5.55 C) 1.66 D) 2.17

299. ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ?
A) 1 : 5 B) 1 : 2 C) 1 : 4 D) 1 : 1

300. બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ ક્યા નામે ઓળખાય છે ?
A) આંતરપાક પદ્ધતિ B) મિશ્રપાક પદ્ધતિ
C) બહુમાળીય પાક પદ્ધતિ D) મિશ્રખેત પદ્ધતિ

301. પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુદ્ધતાઓ હોવી જોઈએ ?
A) 99 B) 99.9 C) 95 D) 96

302. ગુ.કોટ ડી.એચ.7 નીચેના પૈકી ક્યા કપાસની જાત છે ?
A) અમેરિકન કપાસ B) ઈન્ડો-અમેરિકન કપાસ
C) દેશી કપાસ D) આરબોરીયમ કપાસ

303. વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી ક્યા નામે ઓળખાય છે ?
A) સીલ્વીકલ્ચર B) સીલ્વી પાસ્ટોરલ
C) એગ્રો ફોરેસ્ટ્રી D) એગ્રી-હોર્ટીકલ્ચર

304. એમોનિયમ સલ્ફેટમાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે ?
A) 10 ટકા B) 15 ટકા C) 20 ટકા D) 25 ટકા

305. નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ?
A) રેતાળ B) લોમ C) કાંપાળ D) માટીયાળ

306. સંકર-4 કપાસના શોધનાર કોણ હતા ?
A) ડૉ.સી.એલ.પટેલ B) ડૉ.સી.ટી.પટેલ
C) ડૉ.પી.ટી.પટેલ D) ડૉ.સી.કે. પટેલ

307. 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય ?
A) 100 B) 1000 C) 10000 D) 100000

308. બ્લ્યુ રીવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઈ બાબત સાથે સંકળાયલ છે?
A) અનાજ ઉત્પાદન B) તેલ ઉત્પાદન
C) મત્સ્ય ઉત્પાદન D) દૂધ ઉત્પાદન

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

309. ગુજરાતમાં, એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ક્યાં આવેલો છે?
A) ચારણકા (પાટણ) B) વડોદરા (નંદેસરી)
C) ભરૂચ(પાલજ) D) ગોબલજ (ખેડા)

310. સુરત અને ખંભાત ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે ?
A) ખાંડ B) ખાતર C) જરી D) સિમેન્ટ

311. 'કડાણા બંધ'.......... નદી પર બાંધવામાં આવ્યો છે ?
A) તાપી B) નર્મદા C) મહી D) સાબરમતી

284)C, 285)D, 286)C, 287)C, 288)B, 289)D, 290)C, 291)D, 292)A, 293)A, 294)B, 295)A, 296)A, 297)D, 298)A, 299)D, 300)B, 301)A, 302)C, 303)B, 304)C, 305)D, 306)B, 307)C, 308)C, 309)A, 310)C, 311)C.

312. 'ઈફકો' - ખાતર ક્યાં સ્થપાયેલ છે ?
A) અમદાવાદ B) કલોલ C) સુરત D) વડોદરા
313. સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ?
A) મોઢેરા B) પાલીતાણા C) જૂનાગઢ D) પાટણ
314. ગુજરાતનો ક્યો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?
A) સુરત B) ભરૂચ C) ડાંગ D) વલસાડ
315. ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
A) ચાણસ્મા B) કલોલ C) કોયલી D) જગુદણ

GSSSB મિકેનિક - 2017

316. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'ઉદ્વહન સિંચાઈ યોજનાઓ' ખાસ કરીને ક્યા જિલ્લાના સિંચાઈથી વંચિત વિસ્તારના લકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ?
A) દાહોદ જિલ્લો B) તાપી જિલ્લો
C) નવસારી જિલ્લો D) વડોદરા જિલ્લો

વિસ્તરણ અધિકારી - 7/1/2017

317. "ઈફકો"નું આખું નામ શું છે ?
A) ઈન્ડિયન કાર્મર્સ કો-ઓપરેટિવ
B) ઈન્ડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ.
C) ઈન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ.કંપની લિ.
D) ઈન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ.
318. એન.ડી.ડી.બી.નું વડું મથક ક્યાં આવેલું છે ?
A) આણંદ B) બેંગલૂરુ C) ન્યુદિલ્લી D) મુંબઈ
319. "ક્રિભકો"નું આખું નામ શું છે ?
A) કૃષિકાર ભંડાર કો-ઓપરેટિવ લિ.
B) કૃષક ભારતી કો-ઓપરેટિવ લિ.
C) કૃષિ ભારત કો-ઓપરેટિવ લિ.
D) કૃષિવિકાસ ભાવના કો-ઓપરેટિવ લિ.
320. એન.આઈ.સી.એમ.નું આખું નામ શું છે ?
A) નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ
B) નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ
C) નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ
D) નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

321. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે?
A) નીલગિરી B) અરવલ્લી C) સાતપુડા D) વિધ્યાંચળ
322. પોળો ઉત્સવ ગુજરાતના ક્યા તાલુકામાં ઉજવાય છે ?
A) પોસીના B) મેઘરજ C) વિજયનગર D) ઈડર
323. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ ક્યા જિલ્લાનો ભાગ છે?
A) સુરેન્દ્રનગર B) ભરૂચ C) પાટણ D) મહેસાણા
324. ગુજરાતના નીચેના પૈકી ક્યા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે?
A) વેરાવળ B) બેડી C) અલંગ D) ઓખા

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

325. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
A) દેવભૂમિ દ્વારકા B) મોરબી C) જૂનાગઢ
D) જામનગર
326. અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
A) પાટણ B) મહેસાણા C) બનાસકાંઠા D) પંચમહાલ
327. ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ ક્યા જિલ્લામાં આવેલું છે ?
A) મહીસાગર B) કચ્છ C) રાજકોટ D) સુરેન્દ્રનગર

GSSSB હેડ કલાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

328. વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
A) જૂનાગઢ B) અમદાવાદ C) નર્મદા D) વડોદરા
329. મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના ક્યા બન્ને જિલ્લાની હદ મળે છે ?
A) મહીસાગર-દાહોદ B) દાહોદ-છોટા ઉદેપુર
C) છોટા ઉદેપુર-નર્મદા D) પંચમહાલ-દાહોદ
330. ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
A) તાપી B) ડાંગ C) નવસારી D) નર્મદા
331. ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટી (GIFT)નું પૂરું નામ જણાવો.
A) ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી
B) ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેક્નોલોજી-સીટી
C) ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી
D) ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શીયલ ટેક્સ-સીટી
332. હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
A) સુરત B) ડાંગ C) દાહોદ D) પંચમહાલ
333. રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
A) મહેસાણા B) પાટણ C) આણંદ D) તાપી

312)B, 313)A, 314)C, 315)C, 316)A, 317)B, 318)A, 319)B, 320)B, 321)C, 322)C, 323)B, 324)A, 325)A, 326)C, 327)D, 328)A, 329)B, 330)B, 331)A, 332)D, 333)B.

334. ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

A)અમદાવાદ જિલ્લો, છોટા ઉદેપુર જિલ્લો, અરાવલી જિલ્લો, ભરૂચ જિલ્લો

B)પંચમહાલ જિલ્લો, અરાવલી જિલ્લો, ગાંધીનગર જિલ્લો, મહીસાગર જિલ્લો

C)છોટા ઉદેપુર જિલ્લો,આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લો,ગાંધીનગર જિલ્લો

D)વડોદરા જિલ્લો, મહીસાગર જિલ્લો,તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો

335. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલ ઝડપી નિર્ણયો અંતર્ગત આદિજાતિ યુનિવર્સિટીનું નિર્માણ ક્યા કરવાનું નક્કી કરવામાં આવેલ છે ?

A)કેવડીયા B)રાજપીપળા C)રાજકોટ D)ગોધરા

336. બાબરા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?

A)મહેસાણા B)પાટણ C)ભરૂચ D)અમરેલી

HTAT - 2015

337. ગુજરાતમાં કુલ કેટલા ચો. કિ.મી.માં રણ પથરાયેલ છે ? : **27200 ચો.કિ.મી.**

HTAT - 2014

338. ગુજરાત રાજ્ય ક્યા બે અક્ષાંશ વચ્ચે આવેલું છે ? : **20°1 થી 24°7**

339. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકાશિત થતું સામયિક ક્યું છે? : **પ્રકૃતિ**

340. તરણેતરનો મેળો ભરાય તે મંદિર ક્યું છે? : **ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર**

341. સત્ય, અહિંસા જેવા કેટલા મહાવ્રતોની વાત ગાંધીજીએ કરેલી? : **11**

342. નર્મદા ખીણની ભીમબેટકાની ગુફામાંથી શેના પુરાવા મળે ? : **આદિમાનવોનો વસવાટ**

ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

343. ''સૌની યોજના'' ગુજરાતના ક્યા વિસ્તારને સરદાર સરોવર યોજનાનો લાભ આપવા માટે છે ? - **સૌરાષ્ટ્ર**

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 2012

344. SEZનું પુરું નામ શું છે ? - **Special Economic Zone**

345. દહેજ-ઘોઘા વચ્ચે શરૂ ફેરી સર્વિસ ક્યા નામથી ઓળખાશે ? - **રો-રો ફેરી સર્વિસ**

346. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યા શહેરમાં આવેલો છે ? - **રાજકોટ**

347. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે છે ? - **લસુંદ્રા, તુવા, તુલસીશ્યામ**

348. ગુજરાતમાં સામાન્ય રીતે સહુથી વધુ ઠંડી કયાં પડે છે ? - **નલિયા**

349. ગુજરાતમાં વિશ્વનો ફલોરસ્પારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે ? - **આંબાડુંગર, ડુંગરગામ**

350. રણના ઊંચા ભાગને શું કહે છે ? - **લાણાસરી**

351. ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજીને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ ક્યો થાય ? - સાબરમતી, ભાદર, શેત્રુંજી, શેઢી, પૂર્ણા

352. પડખાઉ જમીન એટલે કેવી જમીન ? - **પર્વતીય જંગલોની જમીન**

353. અલંગ - જહાજ ભાંગવાનો ઉદ્યોગ, થાન - ચીનાઈ માટીનો ઉદ્યોગ, રાણાવાવ - સિમેન્ટ ઉદ્યોગ

354. G.M.D.C.નું ફુલ ફોર્મ (full form) શું છે ? - **ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન**

355. વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ? - **બનાસકાંઠા**

356. નર્મદાવેલી ફર્ટિલાઈઝરનું કારખાનું ક્યાં આવેલું છે ? - ભરૂચ

પોલીસ કોન્સ્ટેબલ - 2012

357. ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે? - **રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર**

358. દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો ક્યા રાજ્યનો છે? - **ગુજરાત**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

359. ખિજડીયા પક્ષી અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? - **જામનગર**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

360. ગુજરાત રાજ્યનો ક્યો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? - **કાનમ**

361. ક્યુ પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? - **ઘુડખર**

362. ચીડના રસમાંથી શું બને છે ? - **ટર્પેન્ટાઈન**

363. ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર ક્યું ? - **પોરબંદર**

364. ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ? - **કંડલા**

334)B, 335)B, 336)D.

365. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ ક્યું છે ? - **અકીક**

366. 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડુમથક ક્યા આવેલું છે ? - **આણંદ**

મહેસૂલી તલાટી - 2014

367. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા ક્યા જંગલો ઉપયોગી છે ? - **ચેર**

TET- II - ભાષા - 2014

368. નર્મદા નદી ક્યા રાજ્યોમાંથી પસાર થાય છે ? - **મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

369. ''ધોળી ધજા'' બંધ ગુજરાતની કઈ નદી પર આવેલો છે ? - **ભોગાવો**

370. સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું ? - **પંડિત જવાહરલાલ નહેરુ**

371. કર્કવૃત ગુજરાતના ક્યા બે સ્થળ પરથી પસાર થાય છે ? - **પ્રાંતિજ-હિંમતનગર**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

372. પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? - **દરિયાઈ જીવસૃષ્ટિ**

373. ગુજરાતનું ક્યું શહેર અકીકના વેપાર (ઘરેણા)નું મહત્ત્વનું કેન્દ્ર છે ? - **ખંભાત**

374. ગુજરાત રાજ્ય માટે ક્યું વિધાન સાચું છે ? - **ભારતમાં તેનું સ્થાન, વિસ્તાર પ્રમાણ સાતમુ છે. (હાલમાં છઠ્ઠું), તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 590 કિ.મી. છે, તેનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિ.મી છે, તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 500 કિ.મી છે.**

375. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યા આવેલું છે ? - **અંકલેશ્વર**

376. ગુજરાતમાં 'ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ' આ કહેવત મુજબનું મલાવ તળાવ ક્યા શહેરમાં આવેલું છે ? - **ધોળકા**

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર ક્લાર્ક - 2012

377. 'ખીજડીયા પક્ષી અભયારણ્ય' ક્યા જિલ્લામાં આવેલ છે ? - **જામનગર**

378. 'હાથમતી સિંચાઈ યોજના' ક્યા જિલ્લામાં આવેલ છે ? - **સાબરકાંઠા**

જૂનિયર ક્લાર્ક પેપર - 1 - 2012

379. ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો ? - **પેરીપ્લસ**

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

380. ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન ક્યાં દિવસથી આરંભાય છે ? - **અક્ષય તૃતિયા**

381. કચ્છના મોટા રણપ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે ? - **લાણાસરી**

382. અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ? - **નર્મદા**

383. ગુજરાતમાં ફ્લોરસ્પાર ક્યાં વિસ્તારમાંથી મળી આવે છે ? - **છોટા ઉદેપુર**

384. દરિયાકાંઠાની વનસ્પતિ મેનગ્રુવ્ઝનું ગુજરાતી પર્યાયવાચી નામ છે ? - **ચેર**

385. ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત કઈ છે? - **અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત**

386. ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? - **આઠ**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

387. ગુજરાતની નદીઓ અંગે ક્યું વિધાન સત્ય છે? - **સાબરમતી નદી મેવાડના ઢેબર સરોવરમાંથી નીકળે છે, તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર ઝરામાં છે, ભોગાવો નદીનું મૂળ ચોટીલા પાસેના ડુંગરમાં છે**

388. ગુજરાતનો ક્યો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે? - **સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ**

389. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે? - **છુછાપુરા**

390. કૃષિવિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? - **આણંદ**

391. આકાશવાણી કેન્દ્રો અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો ખેતીવિષયક કાર્યક્રમ ક્યા નામે ઓળખાય છે? - **ખેતી કરીએ ખંતથી**

392. દૂધાળા જાનવરોમાં ક્યા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? - **મસ્ટાઈસ**

393. ગુજરાતની ખેત પેદાશોને થતા રોગો સંબંધમાં જોડકાની માહિતી સત્ય છે ? - **શેરડી-રાતડો-પર્ણની મધ્યશિરા ઉપર નાના-નાના લાલ ટપકાં દેખાય છે, મગફળી-ગેરુ-પર્ણની નીચે ભૂખરા રંગના ટપકાં દેખાય છે તથા પાન ચીમળાને ખરી પડે છે, વટાણા-સુકારો-પર્ણ પીળાં પડીને સુકાઈ જાય છે તથા મૂળ કાળાં પડીને સુકાઈ જાય છે**

394. ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય ? - **સહકારી ફેડરેશન**

395. દેશની સોડાએશની કુલ જરુરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? - **95%**

396. તોલ-માપનાં ત્રાજવાં-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે? - **સાવરકુંડલા**

397. મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે - **કંડલા**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

398. ગુજરાત..............**ખૂણામાં** અંબાજી (આરાસુર) આવેલું છે ? - **ઈશાન**

399. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન........માં આવેલું છે ? - **કાકરાપાર**

400. ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ ? - કાળી જમીન

401. ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંથી પ્રખ્યાત કેરીની જાત સંબંધમાં નીચના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? - જમાદાર

402. મચ્છુ નદીના વહેણ સંદર્ભે ઉદ્ગમથી અંતનો સાચો ક્રમ ક્યો થાય ? - **આણંદપુર પાસેની ટેકરીઓ - વાંકાનેર - મોરબી - માળિયા-મિયાણા - કચ્છનું રણ**

403. બારડોલી................ ઉદ્યોગ માટે જાણીતું છે ? - ખાંડ

404. મહી નદીનો 'મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કરનાર કોણ ? - **અલબેરૂની**

405. 'રાપર' તાલુકા સંદર્ભે કઈ બાબત સાચી છે ? - **કચ્છના મહારાવે વૃક્ષો અને ઘાસ યુક્ત 'રાખાલ' તરીકે ઓળખાતો જંગલનો પટ્ટો તૈયાર કરાવ્યો હતો, તેની ઉત્તર તરફ કચ્છનું મોટું રણ છે, તાલુકાની દરબારગઢ પાસેની ટેકરીમાંથી લાકડિયાવારી નદી નીકળે છે,**

406. મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન-જૂનાગઢની સ્થાપના ક્યારે થઈ હતી ? - **1956**

407. મહુડાના તેલનો કઈ બાબત માટે ઉપયોગ છે? - **સ્ટિયરીક એસિડના ઉત્પાદનમાં કાચામાલ તરીકે, કબજિયાત અને મસામાં રેચક તરીકે, ધોવાના સાબુ બનાવવા માટે**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

408. ગુજરાતના ક્યા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે ? - **પંચમહાલ**

409. વીરપુરમાં કોનું મુખ્ય મંદિર આવેલું છે ? - જલારામ બાપા

410. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડુંમથક ક્યાં આવેલ છે ? - પાટણ

411. ગુજરાતનું વેરાવળ બંદર ક્યા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે ? - **મત્સ્ય ઉદ્યોગ**

412. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી રાખેલ છે ? - 182 મીટર

413. મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાં દાતાર' ક્યા આવેલું છે ? - ઉનાવા

414. ઈસબગુલના વ્યાપારનું મહત્ત્વનું મથક ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહેસાણા**

415. કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? - મહી

416. વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પીંગ સ્ટેશન ક્યા આવેલું છે ? - **સુરેન્દ્રનગર**

417. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો. - હરણફાળ

418. સુપ્રસિદ્ધ અડીકડીની વાવ ક્યાં આવેલી છે ? - જૂનાગઢ

419. કડીપાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલ છે ?- **ફ્લોરસ્પાર**

420. પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલી છે ? - **વલસાડ**

421. ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે ક્યા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભુ કરેલ છે ? - **જામનગર**

422. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યા કરવામાં આવી રહી છે ? - **સાધુ બેટ**

423. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી ? - **પાટણ**

TET- I - 2012/2014

424. કચ્છના ક્યા ગામને ભારત સરકારે 'હેરીટેજ વિલેજ' તરીકે જાહેર કર્યું છે ? - **તેરા**

425. ગુજરાતની કઈ નદીઓ કુંવારીકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે ? - **બનાસ, સરસ્વતી, રૂપેણ**

સબરજિસ્ટ્રાર - 2013

426. ક્યા રોકડીયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? - **મગફળી**

427. ગુજરાતનો ક્યો પ્રદેશ સમુદ્રતળ કરતાં પણ નીચો છે ? - ઘેડ

428. ગુજરાત રાજ્યના ક્યા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ? - **ઉત્તર**

429. ગુજરાતમાં વણાક બોરી વિદ્યુત મથક શેના કેવા પ્રકારનું છે ? - **લિગ્નાઈટ આધારિત**

430. નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે ? - **વિંધ્યાચળના અમર કંટક પાસેથી**

431. યોગ્ય રીતે જોડો - **શેત્રુંજી : ખોડીયાર, બનાસ : દાંતીવાડા, મહી : વણાકબોરી, તાપી :** ઉકાઈ

432. સિરક્રીક ખાડી ગુજરાતના ક્યા જિલ્લાની નજીક આવેલી છે ? - **કચ્છ**

433. ગુજરાતમાં પીપાવાવ બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **અમરેલ**

434. ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ ક્યા સ્થળે વધુ વિકસેલ છે ? - **સુરત**

435. ચાસીયા ઘઉં માટે ગુજરાતનો ક્યો પ્રદેશ પ્રખ્યાત છે ? - ભાલ

TAT - 2012

436. નર્મદા નદી કઈ દિશામાં વહે છે? - **પૂર્વથી પશ્ચિમ**

437. વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો વાડો ભાવનગર પાસે..........ખાતે આવેલો છે? - **અલંગ**

HTAT - 2012

438. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે? - **અકિક**

439. ગુજરાતમાં નીચેનામાંથી ક્યા વિકલ્પમાં પર્વત/ડુંગરના સ્થળ ઉત્તરથી દક્ષિણના ક્રમે છે? - **તારંગાના ડુંગર, પાવાગઢનો ડુંગર, પારનેરા**

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

440. ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી કઈ છે? - **નર્મદા**

441. ગુજરાતનું એક માત્ર ગિરિમથક કયું છે? - **સાપુતારા**

442. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? - **સાબરમતી**

443. દુધસાગર ડેરી ક્યાં આવેલી છે? - **મહેસાણા**

444. કાળો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે? - **કચ્છ**

445. નર્મદા નદી પર ક્યો બંધ બાંધવામાં આવેલો છે? - **સરદાર સરોવર**

446. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે? - **ગિરનાર**

PSI - 2012

447. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે ? - **કાળિયાર**

448. ગુજરાતમાં લિગ્નાઈટ મુખ્યત્વે કયાંથી પ્રાપ્ત થાય છે ? - **પાન્ધ્રો**

449. અલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે ? - **નર્મદા**

450. ગુજરાતનું કયુ શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? - **ખંભાત**

451. એશિયાનુ સૌ પ્રથમ એક્ષ્પોર્ટ પ્રોસેસીંગ ઝોન (EPZ) ક્યા આવેલું છે ? - **કંડલા**

PSI નશાબંધી - 2011

452. જળપ્લાવિત ક્ષેત્ર એટલે ?
- **ઝરણા શાખાઓ દ્વારા બનતો નદી બેસિન વિસ્તાર**

453. ખરીફ પાકો એટલે ક્યા પ્રકારના પાક ?
- **ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો**

454. ગુજરાતના ક્યા જિલ્લામાં સિસુ અને તાંબુ બંને મળે છે ?
- **બનાસકાંઠા**

એકાઉન્ટ ઓફિસર - 1999

455. ક્યા શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું ? - **ભરૂચ**

456. ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય ક્યું છે ?
- **ગુજરાત**

આંકડાકીય અધિકારી - 2000

457. નર્મદા નદીનું મૂળ ક્યા છે ? - **અમરકંટક**

458. ગુજરાતની નર્મદા યોજનાની ટીકા કરતા પુસ્તક 'ધી ગ્રેટર કોમન ગુડ'ના લેખિકા કોણ છે ? - **અરુંધતી રોય**

ચીફ ઓફિસર - 1999

459. નર્મદા યોજનાના વિરોધીઓ ક્યા વિષયને ધ્યાને રાખી આંદોલન કરે છે - **પર્યાવરણ**

460. ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાપીઠનું વડુંમથક ક્યા આવેલું છે ?
- **દાંતીવાડા**

461. ગુજરાતમાં હાઈટેક ઈન્ફોસિટીની સ્થાપના ક્યા થઈ હતી ?
- **ગાંધીનગર**

આયુર્વેદિક ડોક્ટર - 2000

462. નારાયણ સરોવર અભયારણ્ય કોના માટે જાણીતું છે ?
- **ચિંકારા**

463. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે ? - **સાપુતારા**

464. મોઢેરા કઈ બાબત માટે જાણીતું છે ? - **સૂર્ય મંદિર**

વૈદકિય સેવા - 2000

465. બ્લેકબક (કાળિયાર) માટેનું અભયારણ્ય ક્યા આવેલું છે ?
- **વેળાવદર (ભાવનગર)**

આંકડાકીય અધિકારી - 2000

466. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યા આવેલા છે ? - **પાલિતાણા**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

467. સરદાર સરોવર બંધથી ઉત્પન્ન થતી વીજળીનો મહત્તમ હિસ્સો ક્યા રાજયને મળશે ? : **મધ્ય પ્રદેશ**

468. ગુજરાતના ક્યા પ્રસિદ્ધ હિન્દુ યાત્રાધામમાં મૂર્તિની પૂજા થતી નથી ? : **અંબાજી**

469. FTZ શું છે ? : **ફ્રી ટ્રેડ ઝોન**

470. ATIRAનું પૂરું નામ આપો. : **અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન**

471. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યા આવેલું છે ? : **અમદાવાદ**

472. બંદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઈન્ડિયા લિ. ક્યા આવેલી છે ? - **સુરત**

473. ભારતમાં સફેદ ક્રાંતિનું યશ ક્યા શહેરને મળે છે? : **આણંદ**

474. સરદાર સરોવર ડેમની હાલમાં ઊંચાઈ કેટલી છે ? : **138.68 મીટર**

475. મુક્તેશ્વર બંધ કઈ નદી પર બંધાયેલો છે ? : **સરસ્વતી**

476. ગિરનાર પર્વત ક્યા પ્રકારનો ખડક છે? : **અગ્નિકૃત ખડક**

477. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ (IRMA) સંસ્થા ક્યા આવેલી છે? : **આણંદ**

478. ભારતના એન્ટવર્પ તરીકે ક્યું શહેર જાણીતું છે? : **સુરત**

479. સાગના લાકડા માટે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે? : **વલસાડ**

480. લસુંદ્રા ખાતે શું છે? : **ગરમ પાણીના કુંડ**

481. ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડુંમથક ક્યા આવેલું છે? : **દાંતીવાડા**

482. ગ્રેફાઈટનો ઉપયોગ ક્યું શૈક્ષણિક સાધન બનાવવા થાય છે? : **પેન્સિલ**

483. ગુજરાતના ક્યા જિલ્લામાં સૌથી વધુ વસતી જોવા મળે છે ? : **અમદાવાદ**

484. ગુજરાતમાં પ્રતિ વર્ષ શિયાળામાં પક્ષી દર્શન માટે ક્યું સ્થળ જાણીતું છે? : **નળ સરોવર**

485. નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા કોણ છે? : **મેધા પાટકર**

486. 26 જાન્યુઆરી, 2001ના ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભૂજની ક્યા ગામ નજીક હતું ? : **ધ્રાંગ**

487. ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે? : **અમદાવાદ (ગૂજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં)**

488. નર્મદાની વિશેષતા જણાવો. - **નર્મદા ફાટખીણમાં વહે છે, નર્મદા પહોળું નદીમુખ બનાવે છે**

489. પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતને ક્યા નામથી ઓળખાવામાં આવતું હતું ? - **લાટ**

490. બીડી બનાવવા માટે ક્યા પાનનો ઉપયોગ થાય છે ? - **ટીમરૂ**

491. ગુજરાતના ક્યા જિલ્લાઓ બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે ? - **દાહોદ, છોટા ઉદેપુર**

492. કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવાય છે ? - **નર્મદા**

493. બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યા આવેલી છે ? - **ભરૂચ**

494. ગીરમાં ક્યા પ્રકારના વન જોવા મળે ? - **સૂકા પાનખર વન**

495. કેબિનેટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને પરિવહન યુનિવર્સિટીની સ્થાપનાને ....માં મંજૂરી આપી છે. - **વડોદરા, ગુજરાત**

496. ગુજરાતની 29% વસતી ક્યા ત્રણ જિલ્લાઓમાં વસે છે ? - **અમદાવાદ, વડોદરા, સુરત**

497. ક્યા પ્રકારના જંગલોમાં સવાના પ્રકારનું ઊંચું ઘાસ જોવા મળે ? - **સૂકા પાનખર જંગલો**

498. ક્યા પ્રવાસીએ ખંભાતને મહત્ત્વનું બંદર ગણાવ્યું હતું ? - **માર્કોપોલો**

499. ગ્રેફાઈટ ખનિજ કઈ વસ્તુની બનાવટમાં વપરાતું નથી ? - **કાચ**

500. ગુજરાતના પિન્ક સિટી તરીકે ક્યા શહેરને ઓળખાય છે? - **ધ્રાગંધ્રા**

501. જીરાયત જમીન એટલે.......... - **ફક્ત વરસાદ આધારિત જમીન**

502. ક્યા ભૂગોળવિદ્ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા ? - **સ્ટ્રેબો**

503. ગુજરાતમાં ક્ષારીય જમીનને નવસાધ્ય કરવા ખારલેન્ડ એક્ટ ક્યા વર્ષે ઘડાયો હતો ? - **1963**

504. લેડી વિલ્સન મ્યૂઝિયમ ક્યા આવેલું છે ? - **ધરમપુર**

505. સરદાર પટેલ યુનિવર્સિટી ક્યા આવેલી છે ? - **વલ્લભ વિદ્યાનગર**

506. ગુજરાતની પ્રથમ બોટ એમ્બ્યુલન્સ સેવા ક્યા શરૂ કરાઈ ? - **પોરબંદર**

507. રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ આવેલું છે ?- **આણંદ**

508. કચ્છના બન્ની વિસ્તારના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? - **પશુપાલન**

509. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ક્યા આવેલી છે ? - **જામનગર**

510. સૌરાષ્ટ્રનું કાશ્મીર સહુવા કઈ નદી કિનારે વસેલું છે ? - **માલણ**

511. વેળાવદરમાં ક્યા પ્રકારના મેદાનો જોવા મળે ? - **ભવ્ય ઘાસના મેદાનો**

512 ખોડિયર જળાશય યોજના કઈ નદી ઉપર છે ? - **શેત્રુંજી**

513. હિંમતનગર પાસે કઈ નદી પર ડેમ બાંધેલ છે ? - **હાથમતી**

514. પશ્ચિમમાં વહેતી નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે ? - **નર્મદા**

515. ટોલેમી સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ કઈ રીતે કરતાં હતા ? - **સુરાષ્ટ્રીન**

516. ગુજરાતમાં ક્ષારીય જમીનને નવસાધ્ય કરવાની કેટલી પદ્ધતિ છે? - 3

517. મેઈન મેઝ રિસર્ચ સ્ટેશન ક્યા આવેલું છે ? - **ગોધરા**

518. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે રાજકોટ તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે... - **અમદાવાદ**

519. 2001થી 2011ના દસકામાં ગુજરાતની વસતી વૃદ્ધિના દરમાં....... ટકા જેટલો ઘટાડો થયો છે. - **3.49**

520. મિલેટ રિસર્ચ સેન્ટર આવેલું છે. - **જામનગર**

521. એશિયાના સૌપ્રથમ કેમિકલ પોર્ટ તરીકે ખુલ્લુ મુકવામાં આવ્યું? - **દહેજ બંદર**

522. ઘેડ પ્રદેશ ક્યા વિસ્તાર વચ્ચે જોવા મળે છે? - **માણાવદરથી નવીબંદર**

523. ગુજરાતના મેદાનો કાઠિયાવાડની કઈ બાજુએ છે ? - **પૂર્વ બાજુએ**

524. અમરેલી જિલ્લાના પીપાવાવને ક્યા વર્ષે ખાનગી બંદર જાહેર કરાયેલ છે ? - **1998**

525. એશિયાનો પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ક્યો છે? - **કંડલા**

526. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યા જોવા મળે છે ? - **ગાંધીનગર**

527. વડોદરા નજીક ક્યા સ્થળે આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ થાય છે ? - **રમણગામડી**

528. કઈ મહત્તવની દ્વીપકલ્પીય નદી સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી નથી ? - **પેન્નાર**

529. ગણપત યુનિવર્સિટી ક્યા આવેલી છે ? - **ખેરવા (મહેસાણા)**

530. ગુજરામાં સૌથી વધુ સિંચાઈ _____ દ્વારા થાય છે ? - **કૂવાઓ**

531. સૌથી વધુ પાતાળ કૂવાઓ ક્યા જિલ્લામાં આવેલ છે? - **સુરેન્દ્રનગર**

532. યોગ્ય જોડકા જોડો. - **અલંગ-શિપ બ્રેકિંગ યાર્ડ, અંકલેશ્વર-કેમિકલ ઉદ્યોગ, કોયલી- રિફાઈનરી, જામનગર-બ્રાસ પાર્ટ**

533. ગુજરાતના ક્યા મેળાને મિનિકુંભ મેળાનો દરજ્જો મળ્યો છે ? - **ભવનાથનો મેળો**

534. ભરતી, ઓટ અને તોફાનોથી દરિયા કિનારાનું ધોવાણ કોણ અટકાવે છે ? - **ચેર (મેન્ગ્રોવ)**

535. આણંદ જિલ્લામાં ક્યા ગામ પાસે સાબરમતી કોપાલાની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે ? - **વડગામ**

536. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવતો જિલ્લો ક્યો છે ? - **છોટા ઉદેપુર**

537. નવસારી જિલ્લાના ગણદેવીનું પ્રાચીન નામ શું હતું ? - **ગુણપાદિકા**

538. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ? - **મહી**

539. પડિયા અને પતરાળા બનાવવા ક્યા પાનનો ઉપયોગ થાય છે ? - **ખાખરો**

540. રાજસ્થાન સાથે સરહદ બનાવતા જિલ્લાઓ ક્યા છે ? - **કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ**

541. ગુજરાતના ક્યા દરિયાકિનારે વ્હેલ અને શાર્ક માછલી આવતી હોય છે ? - **ઓખા અને વેરાવળ બંદરના દરિયાકાંઠે**

542. કચ્છના વાગડના મેદાનમાં ક્યા ડુંગરાઓ જોવા મળે ? - **કંથકોટના ડુંગરાઓ**

543. આલ્કોહોલ બનાવવા માટે ક્યા વૃક્ષનો ઉપયોગ થાય છે ? - **મહુડાના વૃક્ષો**

544. ક્યા ભારતીય પ્રવાસી સોરઠને સુલકા કહીને ઉચ્ચારતા ? - **હ્યુ એન સંગ**

545. પલ્સ રિસર્ચ સેન્ટર ક્યા સ્થળે આવેલું છે ? - **નવસારી**

546. હૃદય યોજના હેઠળ ગુજરાતના ક્યા એક શહેરનો સમાવેશ થાય છે ? - **દ્વારકા**

547. ગુજરાતમાં વિશાળ ભૂમિ દ્રશ્ય ક્યા જોવા મળે ? - **કચ્છનું નાનું રણ**

548. કાર્બન સિંક (કાર્બન શોષક) તરીકે કોણ કાર્ય કરે છે ? - **ચેર**

549. સંસ્કાર કેન્દ્ર સંગ્રહાલય ક્યા આવેલું છે? - **અમદાવાદ**

550. ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યા આવેલું છે ? - **ધારી**

551. ક્યા જિલ્લાના વિસ્તારને દ્રોણમુખ કહેવાય છે? - **ભાવનગર**

552. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું ? - **પીજ**

553. મહી નદી ક્યા રાજ્યોમાંથી પસાર થતાં બે વખત કર્કવૃત્તને ઓળંગે છે ? - **મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત**

554. કંડલા બંદરનું નવું નામ શું કરી દેવાયું ? - **પંડિત દીનદયાળ પોર્ટ**

555. આદિવાસી વિદ્યાર્થીઓના સંશોધન, વિકાસ તથા ઉચ્ચ અભ્યાસને સરળ બનાવવાના હેતુસર ક્યા જિલ્લામાં આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાનું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે ? - **નર્મદા**

556. વર્ષ 2001થી 2011ના દશકામાં ગુજરાતનો વસતી વૃદ્ધિ દર કેટલો હતો ? - **19.3 %**

557. ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યા જિલ્લામાં થાય છે ? - **કચ્છ**

558. કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતા નીચા ભૂમિ ભાગ પર ક્યું સરોવર આવેલું છે ? - **નળ સરોવર**

559. ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર' આજે ક્યા નામથી ઓળખાય છે ? - **હિંમતનગર**

560. ભરૂચને ક્યા સાહિત્યકાર માહિષ્મતી કહીને સંબોધતા ? - **કનૈયાલાલ મુનશી**

561. નળ સરોવરને શું કહી શકીએ ? - **આદ્ર ભૂમિ આશ્રય સ્થાન**

562. ગુજરાતના આદિવાસી વિસ્તારના યુવક-યુવતીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા પંચમહાલ જિલ્લામાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે ? - **ગુરુ ગોવિંદ યુનિવર્સિટી**

563. ઓખામંડળના દરિયાકિનારેથી ક્યું ખનિજ મળી આવે છે ? - **બોક્સાઈટ**

564. ગુજરાતમાં ઈમારતી લાકડાંમાં ક્યું સાગ ઉત્તમ ગણાય છે? - **વલસાડ**

565. દ્વારકા જતા નજીકનો (ગણેશ) નાગેશ્વર-ગોપીતળાવ તેમજ આજુબાજુના વિસ્તારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? - **દારૂકાવન**

566. હીલસા નામક ખારા પાણીની માછલી ઈંડા મુકવા કઈ નદીમાં આવે છે ? - **નર્મદા**

567. જમીનની અંદર ગયેલા સમુદ્રના ફાંટાને શું કહેવાય છે ? - **અખાત**

568. દીવાસળી બનાવવા માટે ક્યા વૃક્ષનો ઉપયોગ થાય છે ? - **શીમળાના વૃક્ષો**

569. સુરત અને કચ્છ જિલ્લામાં ક્યા સરખા નામે તાલુકો આવેલ છે? - **માંડવી**

570. અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ ઉપર કોર્પોરેશન દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેનું નામ જણાવો. - **કાંકરિયા કાર્નિવલ**

571. પોરબંદર જિલ્લામાં નવી બંદર પાસે કઈ નદી અરબ સાગરમાં ભળી જાય છે? - **ભાદર**

572. દરબાર હોલ મ્યૂઝિયમ ક્યા આવેલું છે ? - **જૂનાગઢ**

573. ક્યા રેલવે સ્ટેશન ઉપર હવાઈ મથક જેવી સુવિધાઓ ઉભી થશે જે ભારતનું ત્રીજા ક્રમનું સુવિધાયુક્ત રેલવે સ્ટેશન હશે ? - **સુરત**

574. દિલ્લી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ભારત સરકારે 24 વિસ્તારો નક્કી કરેલ છે જે પૈકી ગુજરાતમાં કેટલા છે ? - **6**

575. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંના પાકનું ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ? - **અમદાવાદ**

576. પ્રાચીન સમયમાં ઉત્તર તથા મધ્ય ગુજરાત માટે ક્યું નામ પ્રયોજાતું હતું ? - **આનર્ત**

577. ગુજરાતમાં ક્યું નગર સાક્ષરનગર કહેવાય છે ? - **નડિયાદ**

578. સમુદ્ર નજીક નદીઓએ કાદવનો નિક્ષેપ કર્યો હોવાથી તે જમીન ક્યા નામે ઓળખાય છે? - **ભાઠાની જમીન**

579. શિયાલ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર -પીપાવાવ કઈ નદીની મોટા પટની ખાડી ઉપર બાંધ્યું છે ? - **ઝોલાપુરી**

580. ખેતી ન થઈ શકે તેવી જમીનનો ઉપયોગ ____ તરીકે થાય છે? - **ગોચર**

581. ક્યો આબોહવાકીય પ્રકાર મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફેલાયેલો છે ? - **અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય શુષ્ક**

582. સુરેન્દ્રનગર જિલ્લાનું ખારાઘોડા ઉત્પાદન માટે યોગ્ય સ્થળ મનાય ? - **મીઠું**

583. નર્મદા યોજનાને ઝડપી ધોરણે આગળ ધપાવવાના પ્રયત્નો ક્યા મુખ્યમંત્રીએ કર્યા હતા ? - **ચીમનભાઈ પટેલ**

584. ક્યો માર્ગ ખનિજ તત્વોના શોષણ અને વહન માટે સાચો છે ? - **મૂલાધિસ્તક → બાહ્યક → અંતઃસ્તર → પરિચક → આદિદારુ → અનુદારૂ**

585. ચટાઈઓ બનાવવા કે ઢાંકવા ક્યા વૃક્ષનો ઉપયોગ થાય છે ? - **તાડ**

586. કચ્છનો અખાત ક્યા સમુદ્રનો ભાગ છે ? - **અરબસાગર**

587. વોટસન મ્યૂઝિયમ ક્યા આવેલું છે ? - **રાજકોટ**

588. ઝુંડનો મેળો ક્યા ભરાય છે? - **ચોરવાડ**

589. અમૃતવર્ષિણી વાવ ક્યાં આવેલી છે ? - **અમદાવાદ**

590. ઓખા અને બેટદ્વારકા વચ્ચે બનનારો બ્રિજ ક્યો છે ? - **કેબલ સ્ટેઈડ સિગ્નેચર બ્રિજ**

591. શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન.........સ્થળે થાય છે. - **નાગેશ્વર**

592. બેટ દ્વારકાથી શંખોદ્વાર બેટને ક્યા વિસ્તાર તરીકે ઓળખાય છે? - **દારૂકાવન**

593. 'પુષ્પકૃષિ શ્રેષ્ઠતા કેન્દ્ર' (સેંટર ફોર એક્સલન્સ ઈન ફ્લોરિકલ્ચર)ની સંયુક્તપણે ભારત અને ઈઝરાયેલ દ્વારા સ્થાપના થઈ છે. તેનું ઉદ્‌ઘાટન ....માં થયું છે. - **તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં**

594. કઈ નદીનું મુખ ખંભાતના અખાતને અરબ સાગરથી અલગ કરે છે ? - **તાપી નદી**

595. સાબરમતી અને વાત્રક નદીનું સંગમસ્થળ .... છે. - **વૌઠા**

596. GIDB કઈ બાબતના વિકાસ માટેની એક મધ્યવર્તી સંસ્થા છે ? - **દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર**

597. લૂપ્ત સિંધુ નદીનો પૂર્વ મુખનો અવશેષ મનાય છે ? - **કોરીક્રીક**

598. ગુજરાત મેન્ગ્રોવ જંગલના વન આવરણ સંદર્ભે ભારતમાં....... સ્થાને છે. - **દ્વિતીય**

599. સાબરમતી નદી ....થી ઉદ્‌ભવે છે. - **રાજસ્થાનના ઢેબર સરોવર**

600. લંબાઈના સંદર્ભે પશ્ચિમમાં વહેતી નદીઓનો યોગ્ય ક્રમ જણાવો. - **નર્મદા- તાપી - મહી- સાબરમતી**

601. કઈ નદી ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કાર્ય કરે છે ? - **દમણગંગા**

602. સોલંકી શાસકોના સમયમાં ક્યા બંદરને ભારતના પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવ્યું હતું ? - **ખંભાત બંદર**

603. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. - **આનંદપુર**

604. બન્નીનું ઊંચું ઘાસ કચ્છના વિશેષ પ્રકારના રહેઠાણ માટે ઉપયોગી છે? - **ભૂંગા ઝૂંપડાં**

605. ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે ? - **હિરણ**

606. તોફાનોથી રક્ષણ મેળવવા ક્યા સમુદ્રમાં લાંબી બ્રેકવોટર બંધાઈ છે ? - **પોરબંદર**

607. વર્ષ 2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પ્રતિ હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે ? - **918**

608. હરિયાળી ક્રાંતિનો સૌથી વધુ પ્રભાવ ક્યા પાકના ઉત્પાદન પર જોવા મળ્યો ? - **ઘઉં**

609. તળાજા, લોર અને સનાની ટેકરીઓ .... માટે જાણીતી છે. - **બૌદ્ધ ગુફાઓ**

610. દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં .... ઉદ્‌ભવે છે. - **મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી**

611. ભારતના ક્યા રાજ્યમાં રોકડિયા પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને મધ્યભાગમાં કપાસનું વાવેતર થાય છે? - **ગુજરાત**

612. અમૂલ ક્યા પ્રકારની મંડળીનું ઉદાહરણ ગણાય ? - **સહકારી મંડળી**

613. ધોલેરા બંદર પાસે કઈ નદી ખંભાતના અખાતને મળે છે? - **સુખભાદર**

614. આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર કંજેટા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **દાહોદ**

615. ગુજરાના ક્યા ભાગને હરિયાળો પ્રદેશ કહેવાય છે ? - **મધ્ય ભાગ**

616. ગુજરાતના આદિવાસીઓની કઈ એક જાતિ નીગ્રો જેવી કાળી ચામડી અને વાંકળીયા વાળ ધરાવે છે ? - **સીદી**

617. તાપી નદી ....માં જન્મ લે છે. - **સાતપુડા પર્વતમાળા**

618. પાલીતાણાના જૈન મંદિરો ક્યા તીર્થંકર સાથે સંકળાયેલા છે ? - **પ્રથમ તીર્થંકર**

619. ભારતમાં બીજા નંબરનું લાંબુ રેલવે પ્લેટફોર્મ ગુજરાતના ક્યા શહેરમાં છે ? - **મહેસાણા**

620. દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસનું અંતર જણાવો. - **31 કિ.મી.**

621. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની સિંહ પરિયોજના ગીરમાં ક્યારથી શરૂ કરાઈ છે ? - **1972**

622. કચ્છના અખાતને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ? - **આજી**

623. દેશનું સૌપ્રથમ પેરા એથ્લેટ્સ માટેનું તાલીમ કેન્દ્ર ક્યા રાજ્યમાં શરૂ થનાર છે ? - **ગુજરાત**

624. પુર્ણા નદીનું ઉદ્‌ગમ સ્થાન ક્યું છે ? - **પીપળનેરના ડુંગરમાંથી**

625. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ક્યા આવેલી છે ? - **સુરત**

626. સુરત અને જૂનાગઢ જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો શોધો ? - **માંગરોળ**

627. બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલયનું ઉદ્‌ઘાટન.........ખાતે થયું - **નર્મદા, ગુજરાત**

628. સાબરકાંઠા જિલ્લાની ઉત્તરે આવેલો વિસ્તાર ક્યા નામથી ઓળખાય છે? - **પોશીના**

629. સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખ ધરાવતી નદી કઈ છે ? - **ભાદર**

630. ભારતનું પ્રથમ હાઈ સ્પીડ રેલ તાલીમ કેન્દ્ર....... ખાતે સ્થાપવામાં આવશે. - **વડોદરા**

631. ભાવનગર જિલ્લાના અલંગમાં જહાજ ભાંગવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? - **1982-83**

632. શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી ઉદ્‌ભવે છે અને ....ખાડીને મળે છે. - **ખંભાતની**

633. ભારતમાં હિરાની નિર્યાતમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે ? - **95 %**

634. લૂણી નદી પુષ્કર પાસેથી ઉદભવે છે અને શેમાં વહી જાય છે ? - **કચ્છના રણમાં**

635. મહી નદી સમુદ્ર સંગમ પામે તેની દક્ષિણે ક્યું બંદર આવેલું છે? - **કાવી બંદર**

636. ક્યા પ્રકારનો કોલસો કાર્બનનું સર્વાધિક પ્રમાણ ધરાવે છે અને ધુમાડા વગર દહન થાય છે ? - **અનતિજ્વાલાગ્રાહી કોલસો (એન્થ્રેસાઈટ)**

637. વલભી કોણે વસાવ્યું હતું ? - **સેનાપતિ ભટ્ટાર્ક**

638. ગુજરાતમાં કઈ આદિજાતિઓ જોવા મળે છે ? - **રબારી, તોડીયા, કોળી**

639. ગુજરાતમાંથી વહેતી નદીઓ જણાવો. - **સીપુ, શેઢી, બનાસ**

640. કોટન ઝોન તરીકે ક્યા વિસ્તારને ઓળખવામાં આવે છે? - **વીરમગામ**

641. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'મુક્તેશ્વર સિંચાઈ યોજના' કઈ નદી ઉપર કરવામાં આવેલ છે ? - **સરસ્વતી નદી**

642. ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો ઉત્પન્ન કરતાં જિલ્લાઓ ક્યા છે? - **કચ્છ અને બનાસકાંઠા**

643. વિસ્તારના સંદર્ભે, ભારતમાં ગુજરાતનો ક્રમ........ છે. - **6**

644. સવાઈ બેટ ક્યા આવેલો છે ? - **અમરેલી**

645. ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ? - **લોહ અયસ્કના ભંડાર**

646. સાબરમતી જ્યાં ખંભાતના અખાતને મળે છે તેને કઈ ખાડી કહેવાય ? - **કોપાલાની ખાડી**

647. ગુજરાતમાં આબોહવા પરિવર્તન વિભાગ ક્યા વર્ષે સ્થપાયો હતો ? - **2009**

648. નર્મદા તટપ્રદેશમાં સરાસરી વરસાદ આશરે......... છે. - **1178 મિલીમીટર**

649. જ્યા ખેતી થઈ શકે તેવા રણના ઊંચા ભાગને શું કહેવાય છે? - **લાણાસરી**

650. સૂર્યઘાતને ક્યા સાધન દ્વારા મપાય છે? - **પાયરેનોમીટર**

651. ગુજરાતનો કયો ભાગ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલની વૃદ્ધિ માટે સહાય કરે છે ? - **દક્ષિણ અને દક્ષિણ-પૂર્વીય ભાગ**

652. ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની સંખ્યા કેટલી હતી ? - **17**

653. ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે ક્યું રિસર્ચ સ્ટેશન આવેલું છે ? - **ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન**

654. માલની ચડ-ઉતર કરવા કંડલા પાસે ક્યું નાનું બંદર આવેલું છે ? - **ટુના બંદર**

655. નર્મદા નદી ....પાસે ગુજરાતમાં પ્રવેશે છે. - **હાંફેશ્વર**

656. ક્યા વર્ષમાં ગુજરાતમાં પડેલ દુકાળ સાત માસીયા દુકાળ તરીકે જાણીતો છે ? - **ઈ.સ.1628-29**

657. હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન ક્યા આવેલું છે ? - **દાહોદ**

658. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્રક- 2017-18 અન્વયે રાજ્યના ક્યા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસવવાનું ઠરાવવામાં આવ્યું છે ? - **મોઢેરા**

659. મહીથી ઢાઢર નદી વચ્ચે આવેલી કાદવકિચ્ચડવાળી ઊંચી ટેકરીઓને કહેવાય છે ? - **વાકળ પ્રદેશ**

660. શેલ, ખારી, તળાજી આ બધી કઈ નદીની જમણા કાંઠાની ઉપનદીઓ છે ? - **શેત્રુંજી**

661. વલસાડ જિલ્લાની પારડીની ઘાસીયા જમીનનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? - **હિતેન્દ્રભાઈ દેસાઈ**

662. સાપુતારા ગીરીમથક કઈ પર્વતમાળામાં આવેલું છે ? - **સહ્યાદ્રી**

663. શેઢી નદીની ઉત્તરમાં આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે? - **માળ પ્રદેશ**

664. શર્મિષ્ઠા તળાવ ક્યા આવેલું છે ? - **વડનગર**

665. સમુદ્રમાં ક્યા સૌથી વધુ ઊંડાઈ જોવા મળે છે ? - **ગહન સાગરિય ખાઈ**

666. નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન ક્યા સ્થળે આવેલું છે ? - **અમરકંટક**

667. સરદાર સરોવર વિસ્તારમાં કઈ આદિજાતિઓ જોવા મળે છે ? - **ભીલ, વેઈગ્ગા અને ગોંડ**

668. અમદાવાદમાં પહેલી કોટન મિલ ક્યારે સ્થપાઈ ? - **1861**

669. મહી નદીને મહીન્દ્રી દ્વારા ઉલ્લેખ કરતાં હતા ? - **અલબરૂની**

670. નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા ક્યા જિલામાં આવેલું છે ? - **જામનગર**

671. સરદાર સરોવર યોજના હેઠળ સૌથી વધુ પાણી મેળવતું રાજ્ય ક્યું છે ? - **મધ્ય પ્રદેશ**

672. જહાજ બાંધકામ માટે ગુજરાતના ક્યા સ્થળો જાણીતા છે ? - **દહેજ, પીપાવાવ, હજીરા,**

673. ક્ષારશોષક પાક તરીકે ગણના થાય ? - **તમાકુ**

674. ગુજરાતમાં પાવાગઢમાં આવેલું દૂધિયું તળાવ કઈ ભૌગોલિક સંરચના પ્રકારનું છે ? - **જ્વાળામુખી સરોવર**

675. કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવાય છે? - **કાળી જમીન**

676. ગુજરાતમાં દરિયાનું પાણી મીઠું કરવાનો પ્રથમ પ્લાન્ટ ક્યા સ્થપાશે ? - **માળિયા**

677. હાલમાં ગુજરાત અને રાજસ્થાનના ન્યુક્લિયર વીજળી ઉત્પાદક મથકો ક્યા કારણસર સમાચારોમાં આવ્યા હતા ? - **700 મેગાવોટ પ્રેસરાઈઝ હેવીવોટર રીએક્ટરના ઉપયોગ માટે**

678. ગુજરાતમાં ક્યા વિસ્તારને ઘઉંનો કોઠાર કહેવાય છે? - **ભાલ**

679. ભૌગોલિક દષ્ટિએ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ? - **ઉષ્ણ**

680. કપાસનું સૌથી વધુ વાવેતર ક્યા જિલ્લામાં થાય છે? - **સુરેન્દ્રનગર**

681. ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર ક્યા જિલ્લામાં થાય છે? - **બનાસકાંઠા**

682. ભારતના પશ્ચિમ કિનારે ક્યા એકમાત્ર બંદરે પાનામેક્સ જહાજો લાંગરી શકે ? - **મુંદ્રા બંદર**

683. ગુજરાતના ઈજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર/શહેર ક્યું છે ? - **અમદાવાદ**

684. ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાંથી મળે છે? - **આબુરાસ**

685. ચંદન તળાવ ગુજરાતના ક્યા શહેરમાં આવેલું છે ? - **વડોદરા**

686. ગુજરાત મેરીટાઈમ બોર્ડની રચના ક્યારે થઈ હતી ? - **1982**

687. ગુજરાતમાં આવેલા મહેલ 'લખોટા મહેલ' ક્યાં આવેલું છે ? - **જામનગર**

688. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યું છે ? - **આભપરા**

689. કાળી ક્રાંતિ ક્યા ક્ષેત્રે સાથે સંબંધ ધરાવે છે ? - **પેટ્રોલિયમ ઉત્પાદન**

690. ટોલેમી દ્વારા દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ ક્યા નામથી થતો હતો? - **લાટિકા**

691. કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનો ઉપયોગ થાય છે ? - **વાંસના વૃક્ષો**

692. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ? - **ભાદર**

693. પિરોટન બેટને શું કહી શકાય ? - **સમુદ્રીય પરિતંત્ર**

694. ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે ક્યો પ્રદેશ જાણીતો છે ? - **કાનમ**

695. સાબરમતી નદીથી નળ સરોવર સુધી ફેલાયેલા પટ્ટાને ક્યા નામથી ઓળખાય છે? - **નળકાંઠો**

696. અમદાવાદ-વડોદરા નેશનલ એક્સપ્રેસ-વે ક્યા નામથી ઓળખાય છે ? - **મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે**

697. નર્મદા નદી પરનો 'સરદાર સરોવર બંધ' ક્યા પ્રકારનો બંધ છે? - **ગ્રેવીટી ડેમ**

698. ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન દ્વારકા નજીક ક્યા આકાર પામશે ? - **મીઠાપુર**

699. કેનાલમાંથી પાણીના વ્યયનું સૌથી મોટું કારણ. - **સ્રવણ**

700. સૌની યોજના હેઠળ કેટલા કિ.મી. લાંબી ચાર લિંક પાઈપલાઈનની વ્યવસ્થા છે ? - **1126 કિ.મી.**

701. ખાસ પ્રજાતિ, જંગલી ગધેડા ફક્ત......માં જોવા મળે છે. - **કચ્છનું રણ, ગુજરાત**

702. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો ક્યો છે? - **રાજકોટ**

703. ખારેકના ઉત્પાદનમાં વધારા માટે ઉપયોગ થાય છે? - **ટીસ્યુ કલ્ચર**

704. સરદાર સરોવર યોજના ગુજરાત સિવાયના અન્ય ક્યા રાજ્યોને આવરી લે છે ? - **મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન**

705. ભારતનું પ્રથમ ઔદ્યોગિક સૌર સૂક્ષ્મ વીજ સંકલન ...... રાજ્યમાં લાગુ થયું હતું. - **ગુજરાત**

706. દહેજ બંદર ભરૂચ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? - **વાગરા**

707. પાણીનું 'એરેશન'શું દૂર કરે છે ? - **ગંધ**

708. રસાયણ બંદર તરીકે ક્યા બંદરને ઓળખાય છે? - **દહેજ**

709. ક્યો અખાત કચ્છ અને સૌરાષ્ટ્રને અલગ કરે છે ? - **કચ્છનો અખાત**

710. શાતાલી, ઠેબી, ગાગરીયો આ બધી કઈ નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ છે ? - **શેત્રુંજી**

711. મધ્ય ગુજરાતના મેદાનની રચનામાં કઈ નદીનો ફાળો રહેલો છે? - **મહી અને ઢાઢર**

712. ગુજરાતની ઉત્તર-પશ્ચિમ સરહદે પાકિસ્તાન દેશ આવેલો છે, જેની સરહદ કચ્છના મોટા રણમાં આવેલી છે. આ સરહદ કેટલા કિલોમીટરની છે ? - **512 કિ.મી.**

713. મહેસાણા સતલાસણા વિસ્તારને ઓળખાય છે ? - **ગઢવાડા**

714. ખાન સરોવર ક્યા શહેરમાં આવેલું છે ? - **પાટણ**

715. સરકલાની ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? - **અમરેલી**

716. ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત સોલાર પાર્ક'ની સ્થાપના ક્યા સ્થળે કરવામાં આવેલ છે ? - **પાટણ જિલ્લો**

717. ભરૂચ જિલ્લાના ક્યા સ્થળે કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ? - **હાંસોટ**

718. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયનનો પ્રથમ તબક્કો શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે ? - **માંડલ-બેચરાજી**

719. ટોલેમી મહી નદીને શું કહેતા હતા ? - **મોફીસ**

720. કાલોલ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **પંચમહાલ**

721. સરદાર સરોવર યોજના હેઠળ સૌથી વધુ વીજળી મેળવતું રાજ્ય ક્યું છે? - **મધ્ય પ્રદેશ**

722. બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહેવાય છે ? - **દોઆબ**

723. માઉન્ટ આબુ કઈ પર્વત શ્રેણીનો ભાગ છે ? - **અરવલ્લી**

724. નારાયણ સરોવર કચ્છ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલ છે? - **લખપત**

725. રૂકમાવતી નદીના કિનારે ક્યું બંદર આવેલું છે ? - **માંડવી**

726. ભૂકંપની તિવ્રતાની દૃષ્ટિએ કચ્છનો પ્રદેશ ભૂકંપગ્રસ્ત વિસ્તારોના ક્યા ઝોનમાં આવે છે ? - **પાંચમાં**

727. સૌરાષ્ટ્રમાં ડુંગરાળ પ્રદેશમાં આવેલી દક્ષિણની ટેકરીઓ ઓળખાય છે. - **ગિરની ટેકરીઓ**

728. ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યા આવેલું છે ? - **ધારી**

729. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ...... જિલ્લામાં છે અને સૌથી ઓછો વિસ્તાર..... જિલ્લામાં છે. - **મહેસાણા, ડાંગ**

730. ગુજરાતમાં પઢાર, કોટવાળીયા, સિદી કઈ જાતિઓ ગણાય ? - **મૂળ આદિજાતિ**

731. ગુજરાતમાં આદિવાસીઓના મુખ્ય ખોરાક નાગલીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા થાય છે? - **ડાંગ જિલ્લો**

732. એશિયાનો પહેલો આબોહવા પરિવર્તનનો એક અલગ વિભાગ સ્થાપ્યો છે અને વિશ્વમાં ચોથો એવો પ્રાંત છે જે આબોહવા પરિવર્તન વિભાગ ધરાવે છે....- **ગુજરાત**

733. ડાકોરમાં ક્યું તળાવ જોવાલાયક છે ? - **ગોપીતળાવ**

734. ક્યા સ્થળે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની યાદમાં બળવંતસાગર સરોવર (બંધ)ની રચના થયેલી છે ? - **સુથરી**

735. કઈ નદીનું મૂળ અમરકંટક પર્વતમાં આવેલ છે ? - **નર્મદા**

736. મગફળીના ઉત્પાદન માટે ક્યા પ્રકારનું હવામાન જરૂરી છે ? - **આર્દ્ર અને ઉષ્ણ હવામાન**

737. ભારતની 2011ની વસતી ગણતરીની વિગત પ્રમાણે ગુજરાતની વસતી ગીચતા........ છે. - **308**

738. સીપુ અને બાલારામ કઈ નદીઓની શાખા છે ? - **બનાસ**

739. ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ (એવીયરી) ક્યાં આવેલું છે? : **ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન - ગુજરાત**

740. જીરુંના ઉત્પાદનમાં ગુજરાત ક્યા ક્રમે છે? - **પ્રથમ**

741. મુંદ્રાબંદરને નૈઋત્યના મોસમી પવનોથી ક્યો ટાપુ રક્ષણ આપે છે? - **નવીનાલ ટાપુ**

742. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ? : **શક્કરબાગ - જૂનાગઢ**

743. ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ ક્યા પાકને મળવાપાત્ર છે ? - **કપાસ**

744. સંત મેકરણદાદાની સમાધિ આવેલી છે ? - **હબા ડુંગર**

745. વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતમાં ક્યા બે સ્થળો વચ્ચે સી-પ્લેન દ્વારા મુસાફરી કરવામાં આવેલી ? : **સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ સરોવર (ડેમ)**

746. SEZ અધિનિયમ, 2004 ઘડ્યા પહેલા ગુજરાતમાં કેટલા SEZ કાર્યરત હતા ? - **3**

747. પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ક્યા જિલ્લામાં આવેલું છે ? : **ભાવનગર**

748. કાંનજી માલમ ક્યા બંદરે વહાણ લાંગરા હતા ? - **માંડવી**

749. પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી ક્યા જિલ્લામાં આવેલો છે ? : **નવસારી**

750. ગુજરાતના ક્યા માત્ર એક જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં ડુંગળીનો પાક લેવાય છે ? - **ગાંધીનગર**

751. ભારતની સૌથી તરણસ્પર્ધા ક્યા યોજાય છે ? - **ચોરવાડથી વેરાવળ**

752. મેઘરજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **અરવલ્લી**

753. સરસ્વતી નદી ક્યા લુપ્ત થઈ જાય છે ? - **કચ્છના નાના રણમાં**

754. અરબ સાગરને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે? - **ભાદર**

755. સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરીંગ એન્ડ ટૂલ્સ ક્યા આવેલી છે ? - **અમદાવાદ**

756. યોગ્ય જોડકું જોડો. - **દાંતીવાડા-બનાસ, ઉકાઈ-તાપી, કડાણા-મહી, ધરોઈ-સાબરમતી**

757. માણસા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? : **ગાંધીનગર**

758. બુટાડીનનો ઉપયોગ કઈ બનાવટમાં થાય છે ? - **કૃત્રિમ રબર**

759. સાગરમાલા પ્રોજેક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? - **બંદરોનો વિકાસ**

760. ભારતની પ્રથમ રાષ્ટ્રીય કોસ્ટલ પોલિસીંગ એકેડમી, નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસીંગ (NACP) પોલીસદળોને તાલીમ આપવા સારુ .... ખાતે સ્થપાઈ છે. - **દેવભૂમિ દ્વારકા**

761. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ક્યો છે ? - **બનાસકાંઠા**

762. ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે ? - **ભાદર**

763. ગ્રે ક્રાંતિ ક્યા ક્ષેત્રમાં જોવા મળી ? - **ખાતર ઉત્પાદન**

764. તુવેરદાળનું સૌથી વધુ ઉત્પાદન કરતું સ્થળ ક્યું છે ? - **વાસદ**

765. ગુજરાતના ક્યા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણધ્રુવનું સ્થળ જોઈ શકાય છે ? : **સોમનાથના મંદિરથી**

766. દરિયાઈ પાણીનો જે જમીનનો ભાગ રોકી શકે છે તેને કહેવાય છે? - **લગૂન સરોવર**

767. ગુજરાતમાં સૌપ્રથમ વીજળી આધારિત ટ્રેન ક્યા શરૂ થઈ ? : **અમદાવાદથી મુંબઈ**

768. બંદરોનો વિકાસ કરનાર સંસ્થા ગુજરાત અદાણી પોર્ટ અને SEZ લિ. ક્યા આવેલી છે ? - **કચ્છ**

769. ગુજરાતના મેદાનોના અંદરની કઈ બાબત વિવિધ પ્રવાહોના સ્રોતો ધરાવે છે ? - **ઉચ્ચ પ્રદેશો**

770. કઈ નદી ભારતમાં બે વાર કર્કવૃત ઓળંગે છે ? - **મહી**

771. સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ ક્યો છે? - **ફેધમ**

772. ગુજરાતમાં ફ્લોરસ્પાર ક્યાંથી મળી આવે છે ? - **આંબા ડુંગર**

773. ગુજરાતમાં ક્યા 100% સૌર શક્તિ સ્વાસ્થ્ય કેન્દ્રો છે ? - **સુરત**

774. સુરત અને ભાવનગર જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો ક્યો છે? - **મહુવા**

775. મગફળી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? - **જૂનાગઢ**

776. ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચો પર્વત ક્યો છે ? - **ગિરનાર**

777. વડોદરા રાજ્ય તરફથી સૌપ્રથમ ગુજરાતમાં પાતાળકૂવો ક્યા થયો હતો ? - **મહેસાણા**

778. બહેડાના વૃક્ષનો કઈ બાબત માટે ઉપયોગ થાય છે ? - **આયુર્વેદિક ઔષધિ**

779. બેસાલ્ટ અને ટ્રેપના પથ્થરો મુખ્યત્વે ....કામમાં વપરાય છે. - **રોડ**

780. મહેસાણા જિલ્લાનો બહુચરાજી તાલુકાનો પ્રદેશ કહેવાય છે ? - **ચુંવાળ પ્રદેશ**

781. વિશ્વનો સૌથી વિશાળ ડેરી વિકાસ કાર્યક્રમ ક્યો છે ? - **ઓપરેશન ફ્લડ**

782. દિલ્હીમાં ચાલતી મેટ્રો રેલના વેગન બનાવતી કેનેડાની 'બોમ્બાર્ડિયર' કંપનીનું વિશાળ ઉદ્યોગ સંકુલ ગુજરાતમાં ક્યા કાર્યરત્ છે ? : વડોદરા - **સાવલી**

ગુજરાતના જિલ્લા

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
   A) બનાસકાંઠા B) સાબરકાંઠા C) કચ્છ D) પોરબંદર
2. દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે ?
   A) સુરત B) તાપી C) નવસારી D) ભરૂચ
3. ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
   A) વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર
   B) તાપી, ભરૂચ, નવસારી, નર્મદા
   C) નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ
   D) છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી
4. ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
   A) સુરેન્દ્રનગર B) સાબરકાંઠા C) ગાંધીનગર D) ભરૂચ
5. કુદરતી ગેસના ભંડારનું ઉદ્‌ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે ?
   A) નવસારી B) ભરૂચ C) અરાવલી D) આણંદ
6. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
   A) અરવલ્લી B) આણંદ C) છોટા ઉદેપુર D) મહીસાગર
7. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
   A) બોટાદ B) મોરબી C) ભાવનગર D) અમદાવાદ
8. ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે ?
   A) તાપી B) સુરત C) મહીસાગર D) વડોદરા
9. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
   A) અમદાવાદ B) મોરબી C) સુરત D) રાજકોટ
10. દરિયાઈ ખનીજ તેલનું ઉદ્‌ભવનસ્થાન આલિયા બેટ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    A) જામનગર B) ભરૂચ C) અમદાવાદ D) આણંદ
11. ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
    A) દાહોદ B) ખેડા C) સાબરકાંઠા D) મહીસાગર
12. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
    A) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ - સુથરી — 1. આણંદ જિલ્લો
    B) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર - હાથબ — 2. કચ્છ જિલ્લો
    C) નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ — 3. ભાવનગર જિલ્લો
    D) વિશાળ થર્મલ પાવર સ્ટેશન - ધુવારણ — 4. રાજકોટ જિલ્લો
    A) A-2, D-1, C-4, B-3 B) D-1, C-4, B-2, A-3
    C) C-3, B-4, A-2, D-1 D) B-3, A-4, D-2, C-1

રેવન્યૂ તલાટી - 28/02/2016

13. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
    a) સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા — 1) અમરેલી જિલ્લો
    b) કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી — 2) ભરૂચ જિલ્લો
    c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર — 3) રાજકોટ જિલ્લો
    d) પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત — 4) અમદાવાદ જિલ્લો
    A) a-4, b-1, c-3, d-2 B) b-1, c-2, d-3, a-4
    C) c-3, d-4, a-2, b-1 D) d-2, a-1, b-3, c-4
14. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
    a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર — 1) પંચમહાલ જિલ્લો
    b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલશીશ્યામ — 2) સાબરકાંઠા જિલ્લો
    c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર — 3) મોરબી જિલ્લો
    d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર — 4) ગીર સોમનાથ જિલ્લો
    A) a-3, b-1, d-2, c-4 B) b-4, d-1, c-2, a-3
    C) d-1, c-4, a-3, b-2 D) c-2, a-3, b-1, d-4
15. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
    A) સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો
    B) મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો
    C) દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો
    D) બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

1)C, 2)A, 3)B, 4)A, 5)D, 6)C, 7)C, 8)C, 9)B, 10)B, 11)A, 12)A, 13)A, 14)B, 15)D.

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

16. 'શબરી ધામ મંદિર' નીચેનામાંથી ક્યા જિલ્લામાં આવેલું છે ?
A)ડાંગ B)સાબરકાંઠા C)વલસાડ D)નર્મદા

17. ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ?
A)અમદાવાદ B)રાજકોટ C)ગાંધીનગર D)વડોદરા

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

18. ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ?
A)સુરેન્દ્રનગર B)પોરબંદર C)કચ્છ D)બનાસકાંઠા

19. દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો.
A)કૃષ્ણ સેતુ B)સુદામા સેતુ C)મૈત્રી સેતુ D)ભક્તિ સેતુ

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

20. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ?
A)સંતરામપુર B)કડાણા C)લુણાવાડા D)વીરપુર

21. ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ?
A)સાબરકાંઠા B)દાહોદ C)છોટા ઉદેપુર D)નર્મદા

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

22. ગુજરાતના ક્યા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે?
A)મહેસાણા B)સાબરકાંઠા C)પાટણ D)બનાસકાંઠા

23. એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં આવેલી છે?
A)અમરેલી B)પોરબંદર C)જૂનાગઢ D)ભાવનગર

24. 'મહાત્મા મંદિર' નીચેનામાંથી ક્યા શહેરમાં આવેલું છે ?
A)પોરબંદર B)દિલ્હી C)અમદાવાદ D)ગાંધીનગર

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

25. ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ?
A)પાલીતાણા B)આણંદ C)જામનગર D)ગાંધીનગર

26. ગુજરાતના ક્યા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ?
A)ખંભાત (ખેડા) B)ઊંઝા (મહેસાણા)
C)હિંમતનગર (સાબરકાંઠા) D)પાલનપુર (બનાસકાંઠા)

કોન્સ્ટેબલ - 2015

27. નવો મોરબી જિલ્લો ક્યા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?
A)રાજકોટ B)રાજકોટ અને સુરેન્દ્રનગર
C)રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
D)રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર

28. અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?
A)શાહપુર B)દરિયાપુર C)કાલુપુર D)લાલ દરવાજા

બિન સચિવાલય ક્લાર્ક - 2016

29. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.

1) અડીકડીની વાવ	a) પાટણ
2) કાજી વાવ	b) ભદ્રેશ્વર
3) રાણકી વાવ	c) હિંમતનગર
4) દૂધિયા વાવ	d) જૂનાગઢ

A) 3-a, 1-d, 2-c, 4-b B) 3-b, 1-a, 2-c, 4-d
C) 3-d, 1-c, 2-b, 4-a D) 3-c, 1-b, 2-a, 4-d

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

30. ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલું છે?
A)કચ્છ B)દેવભૂમિ દ્વારકા
C)મોરબી D)સુરેન્દ્રનગર

31. 'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
A)બોટાદ B)જામનગર C)ભાવનગર D)અમરેલી

32. ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ?
A)સુરત B)તાપી C)નર્મદા D)વડોદરા

33. ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે?
A)યાર્ન એક્સપોર્ટ B)કેમિકલ એક્સપોર્ટ
C)મત્સ્ય ઉદ્યોગ D)શિપ બ્રેકિંગ યાર્ડ

GPSC પ્રિલિમ - 2007

34. NID સંસ્થા ક્યા આવેલી છે ?
A)વડોદરા B)અમદાવાદ C)સુરત D)રાજકોટ

35. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ?
A)છોટા ઉદેપુર B)ધરમપુર C)વાંસદા D)આહવા

16)A, 17)D, 18)C, 19)B, 20)C, 21)B, 22)D, 23)C, 24)D, 25)B, 26)B, 27)D, 28)C, 29)A, 30)A, 31)C, 32)B, 33)D, 34)B, 35)D.

PSI ખાતાકીય - 23/04/2017

36. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે ?
A)અમદાવાદ B)ગાંધીનગર C)વડોદરા D)રાજકોટ

37. પાટડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
A)કચ્છ B)ભાવનગર C)અમરેલી D)સુરેન્દ્રનગર

38. ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
A)અમદાવાદ જિલ્લો, છોટા ઉદેપુર જિલ્લો, અરવલી જિલ્લો, ભરૂચ જિલ્લો
B)પંચમહાલ જિલ્લો, અવરલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો
C)છોટા ઉદેપુર જિલ્લો, આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લા, ગાંધીનગર જિલ્લો
D)વડોદરા જિલ્લો, મહિસાગર જિલ્લો, તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો

39. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
A)નવસારી B)છોટા ઉદેપુર C)ભરૂચ D)તાપી

40. ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
A)પાટણ B)કચ્છ C)બનાસકાંઠા D)ભાવનગર

41. ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે?
A)મહીસાગર B)સાબરકાંઠા C)નર્મદા D)ખેડા

GPSC Class-1 - 2016

42. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ક્યા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700 + મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે ?
A)સાબરકાંઠા B)કચ્છ C)પાટણ D)બનાસકાંઠા

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

43. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે?
A)ભૂંગા B)ઢગા C)ભેલૂડા D)ચોણડા

44. ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે?
A)યમુનાજી ઘાટ B)ગોમતી C)સુનયના D)વિપ્રા

45. ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે.
A)નર્મદા B)આજી અને ન્યારી
C)તાપી D)મહી

GPSC Class - 2 - 12/2/2017

46. "સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે?
A)નડાબેટ B)દ્વારકા C)મુંદ્રા D)હાજીપીર

GPSC Class-1 - 15/01/2017

47. નીચેનામાંથી ક્યા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીની છે ?
A)અમરેલી B)નર્મદા C)તાપી D)ડાંગ

48. વિભાગ - Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ - IIની યાદીના શહેરો સાથે જોડો.

વિભાગ - I	વિભાગ - II
1) નારાયણ સરોવર (કોટેશ્વર)	I) વડોદરા (પાલેજ) પાસે
2) નારેશ્વર	II) નખત્રાણા (કચ્છ પાસે)
3) બિંદુ સરોવર	III) ભરૂચ પાસે
4) ભાડભૂતેશ્વર મહાદેવ	IV) સિદ્ધપુર(પાટણ)

A) 1-I, 2-II, 3-III, 4-IV B) 1-IV, 2-III, 3-I, 4-II
C) 1-II, 2-I, 3-IV, 4-III D) 1-IV, 2-III, 3-II, 4-I

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

49. UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ?
A)વડોદરા B)પંચમહાલ C)સાબરકાંઠા D)બનાસકાંઠા

50. ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભ્યારણો ક્યા જિલ્લામાં આવેલાં છે ?
A)અમદાવાદ B)બનાસકાંઠા C)સુરેન્દ્રનગર D)જામનગર

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

51. નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે?
A)જુનાગઢ B)અમરેલી C)રાજકોટ D)બનાસકાંઠા

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

52. 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
A)કચ્છ B)પાટણ C)મહેસાણા D)બનાસકાંઠા

36)B, 37)D, 38)B, 39)A, 40)A, 41)A, 42)D, 43)A, 44)B, 45)B, 46)A, 47)D, 48)C, 49)B, 50)D, 51)D, 52)B.

નાયબ ચિટનીશ - 02/06/2015

53. નીચેના પૈકી કોણ અલગ પડે છે?
A)બોટાદ B)મોડાસા C)મહિસાગર D)મોરબી

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

54. વેરાવળ કયા જિલ્લાનું મુખ્યમથક છે ?
A)જૂનાગઢ જિલ્લો B)ગીરસોમનાથ જિલ્લો
C)જામનગર જિલ્લો D)અમરેલી જિલ્લો

55. તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ?
A)સોનગઢ B)ઉકાઈ C)વ્યારા D)વેડછી

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

56. 'મફત કાનૂની સેવા સત્તા મંડળ'ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ?
A)અમદાવાદ B)ગાંધીનગર C)રાજકોટ D)વડોદરા

GSSSB મિકેનિક - 2017

57. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
A)વડોદરા B)નર્મદા C)તાપી D)સુરત

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

58. લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
A)ખેડા B)બનાસકાંઠા C)સુરેન્દ્રનગર D)પાટણ

59. ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
A)કચ્છ B)સુરેન્દ્રનગર C)ડાંગ D)જૂનાગઢ

60. ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
A)પોરબંદર B)ભાવનગર
C)રાજકોટ D)ગીર સોમનાથ

GSSSB સર્વેયર - 2016-17

61. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે?
A)ભાવનગર B)કચ્છ C)તાપી D)ખેડા

62. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
A)સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો
B)મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો
C)દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીરસોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો
D)બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

63. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌ પ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા-મુક્ત (Open Defecation Free) જાહેર કરાયો?
A)નર્મદા B)ડાંગ C)અમદાવાદ D)બારડોલી

મુખ્ય સેવિકા - 8/1/2017

64. ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?
A) અમદાવાદ B) વડોદરા C) જામનગર D) રાજકોટ

વિસ્તરણ અધિકારી - 7/1/2017

65. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે?
A) વડોદરા B) અમદાવાદ C) ગાંધીનગર D) રાજકોટ

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

66. ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ?
A)અમદાવાદ B)મહેસાણા C)રાજકોટ D)સુરત

67. અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું?
A)ભારતનું માંચેસ્ટર B)ભારતનું કર્ણાવટી
C)ભારતનું ટેક્સાસ D)ભારતનું હેરિટેજ

68. ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ?
A)ડાંગ B)જૂનાગઢ C)રાજકોટ D)નવસારી

69. માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
A)અમરેલી B)સાબરકાંઠા C)ખેડા D)અરવલ્લી

53)B, 54)B, 55)C, 56)A, 57)C, 58)C, 59)A, 60)B, 61)B, 62)D, 63)A, 64)C, 65)B, 66)B, 67)A, 68)A, 69)D.

70. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો

a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતુ સ્થળ-બાલારામ — 1) દાહોદ જિલ્લો

b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા — 2) આણંદ જિલ્લો

c) નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ — 3) બનાસકાંઠા જિલ્લો

d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા — 4) અરવલી જિલ્લો

A) a-3, c-4, b-1 d-2 B) c-2, b-4, d-1, a-3

C) b-4, d-3, a-1, c-2 D) d-1, a-4, c-3, b-2

71. રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

A) આણંદ B) ખેડા C) પંચમહાલ D) કચ્છ

72. ઓઈલ રીફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે ?

A) તાપી B) કચ્છ C) જામનગર D) વડોદરા

73. ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

A) સાબરકાંઠા B) ગાંધીનગર C) સુરેન્દ્રનગર D) પંચમહાલ

74. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

A) મહેસાણા B) મહીસાગર C) અરવલ્લી D) ગાંધીનગર

75. સુરેન્દ્રનગર જીલ્લોને કયા જીલ્લાની હદ અડતી (સ્પર્શતી) નથી?

A) અમરેલી B) અમદાવાદ C) મોરબી D) બોટાદ

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

76. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

A) ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ - ભાલકાતીર્થ — 1) પોરબંદર જિલ્લો

B) નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર - વાલસુર — 2) ગીરસોમનાથ જિલ્લો

C) રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ - ચોરવાડ — 3) જામનગર જિલ્લો

D) હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ- મિયાણી — 4) જૂનાગઢ જિલ્લો

A) A-2, B-4, D-3, C-1 B) B-3, D-1, C-2, A-4

C) D-1, C-4, A-2, B-3 D) C-4, A-3, B-2, D-1

77. ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુંદ્રા કયા જિલ્લામાં આવેલું છે ?

A) ખેડા B) આણંદ C) બનાસકાંઠા D) નર્મદા

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

78. દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? - કચ્છ

79. અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? - કચ્છ

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

80. 1લી મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે રાજ્યને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું ? - 17

પોલીસ કોન્સ્ટેબલ - 2012

81. નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે? - સાપુતારા ગીરીમથક : ડાંગ જિલ્લો, ધોલાવીરાના અવશેષો : કચ્છ જિલ્લો, લોથલ બંદરના અવશેષો : અમદાવાદ જિલ્લો

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

82. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? - ભાવનગર

83. ચોટીલો તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? - સુરેન્દ્રનગર

84. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? - અમદાવાદ

પ્રોબેશન ઓફિસર - 2016

85. ભગવાન શ્રીકૃષ્ણએ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતાં એવી લોકવાયકા છે. આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? - પોરબંદર

86. ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? - ભાવનગર

87. બેચરાજી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? - મહેસાણા

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

89. ગાંધીજીનું સ્મારક કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે ? - પોરબંદર

88. વસતી અને વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો? - ડાંગ

90. ચિલ્ડ્રન યુનિવર્સિટી કયા આવેલી છે ? - ગાંધીનગર

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

91. ગુજરાતમાં 'બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડઝ'ની કચેરી કયા શહેરમાં આવેલી છે ? - અમદાવાદ અને રાજકોટ

70)B, 71)D, 72)D, 73)A, 74)B, 75)A, 76)C, 77)A.

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

92. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે ? - ડાંગ

નાયબ મામલતદાર/DY.S.o - 2012

93. નીચેના પૈકી ક્યું જોડકું સાચું છે? - સુદર્શન-સરોવર-જૂનાગઢ-જૂનાગઢ જિલ્લો, હમીરસર તળાવ-ભૂજ-કચ્છ જિલ્લો, નળ સરોવર-સાણંદ-અમદાવાદ જિલ્લો
94. સાચું જોડકું - ડાકોર-જિલ્લો : ખેડા-રણછોડરાય મંદિર, ઉનાવા-જિલ્લો : મહેસાણા-મીરા દાતારની દરગાહ, ભદ્રેશ્વર-જિલ્લો : કચ્છ-ભગવાન મહાવીરનું જૈન તીર્થ, ઉદવાડા-જિલ્લો : વલસાડ-પારસી તીર્થધામ

નાયબ મામલતદાર/DY.S.o - 2015

95. નવરચીત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક..... છે. - લુણાવાડા

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

96. પ્રસિદ્ધ 'દરિયાઈ દરગાહ' ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે. આ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - મહીસાગર
97. ભૂજ તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - કચ્છ

સબ ઓડિટર - 2015

98. રાજા પ્રહલાદન દેવ દ્વારા ક્યું નગર વસાવવામાં આવ્યું હતું ? - પાલનપુર
99. વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને ક્યા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? - બનાસકાંઠા-મહેસાણા
100. 1997ના વર્ષમાં ગુજરાત રાજયમાં ક્યા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ? - આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર

સબરજિસ્ટ્રાર - 2013

101. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતાં પ્રથમ બે જિલ્લાઓ ક્યા રાજ્યમાં આવેલાં છે ? - ગુજરાત - જમ્મુ-કાશ્મીર
102. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2012 માટે એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર ક્યા જિલ્લામાં આવેલું છે ? - જૂનાગઢ (બાણેજ)

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

103. તાજેતરમાં જામનગર જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? - દેવભૂમિ-દ્વારકા
104. પિરોટન ટાપુ ક્યા જિલ્લામાં આવેલા છે? - જામનગર
105. અંબાજી ક્યાં જિલ્લામાં આવેલ છે? - બનાસકાંઠા
106. તમે 12 જ્યોર્તિલિંગમાંના એક નાગેશ્વરમાં છો તો તમે ગુજરાતના ક્યા જિલ્લામાં છો? - દેવભૂમિ દ્વારકા
107. જિલ્લો અને વડુ મથકની જોડ - કચ્છ-ભૂજ, પંચમહાલ-ગોધરા, સાબરકાંઠા-હિંમતનગર
108. ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે? - 33
109. અક્ષરધામ મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે? - ગાંધીનગર
110. ઈંદ્રોડા પાર્ક ક્યાં આવેલો છે? - ગાંધીનગરમાં

PSI - 2012

111. ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે ? - વલસાડ
112. નિલમ બાગ પેલેસ ક્યા શહેરમાં છે ? - ભાવનગર
113. N.I.D સંસ્થા ક્યા આવેલી છે ? - અમદાવાદ
114. 1 લી મે, 1960ના રોજ ગુજરાત રાજયમાં કેટલા જિલ્લા હતા ? - 17

એકાઉન્ટ ઓફિસર - 1999

115. ક્યા જિલ્લામાં કાળા હરણનું અભયારણ્ય છે ? - ભાવનગર (વેળાવદર)

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

116. ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્થળ ક્યું છે ? - ગાંધીનગર
117. ક્યા શહેરના બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે ? - જામનગર
118. બાયોવિલેજ ગામ ક્યું છે ? - મોછા (પોરબંદર)
119. મેઘાણી મહોત્સવનું આયોજન ક્યા થાય છે ? - બોટાદ
120. ધીરુભાઈ અંબાણીનું વતન ક્યું છે ? - ચોરવાડ (જૂનાગઢ)
121. SVNIT ક્યા આવેલ છે ? - સુરત
122. કડિયો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ? - ભરૂચ
123. ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ જિલ્લાની રચના થઈ - ગાંધીનગર
124. જૂનાગઢ હાઉસ ક્યા આવેલ છે ? - રાજકોટ
125. સંત આપા ગીગાની સમાધિ ક્યા આવેલી છે ? - સતાધાર
126. ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સાથે શું બંધબેસતું છે ? - રાજકોટ
127. દેવોના મોસાળ તરીકે ઓળખાય ? - સિદ્ધપુર (પાટણ)
128. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાય ? - આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
129. ISKCONનું પૂરું નામ આપો. - ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ
130. ડાયનોસોરના ઈંડા મળી આવ્યું હોય તેવું સૌપ્રથમ સ્થળ ક્યું છે? - રૈયાલી (મહીસાગર)
131. રણમલ ચોકી ક્યા સ્થળ સાથે સંબંધિત છે ? - ઈડર
132. ડોલોમાઈટ ક્યાંથી મળી આવે છે ? - છૂછાપુરા (છોટા ઉદેપુર)
133. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યા નોંધાય છે ? - ડીસા
134. દેશનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ ક્યા જિલ્લામાં આકાર પામ્યો છે ? - મહેસાણા
135. ક્યા સ્થળે બ્રહ્માજીનું મંદિર છે ? - ખેડબ્રહ્મા
136. હાટકેશ્વર મહાદેવ મંદિર ક્યા આવેલું છે ? - વડનગર
137. રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું ? - ઠાકોર વિભોજી જાડેજા
138. ગુજરાતના ક્યા શહેરને પીન્ક સિટી તરીકે ઓળખાય છે ? - ધ્રાંગધ્રા
139. યુકેલિપ્ટસનો જિલ્લો કહેવાય છે - ભાવનગરને
140. કબા ગાંધીનો ડેલો ક્યા આવેલ છે ? - રાજકોટ

141. ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહેસાણા**

142. પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર સાથે ક્યો જિલ્લો સંબંધિત છે ? - **સુરેન્દ્રનગર**

143. કચ્છ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે ? - **બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી**

144. અમદાવાદની સ્થાપનાનું સ્થળ ક્યું છે ? - **માણેકબુરજ**

145. ખોડીયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ભાવનગર**

146. નારદ-બ્રહ્માની મૂર્તિવાળું કામરેજ ક્યા જિલ્લામાં છે ? - **સુરત**

147. ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ગાંધીનગર**

148. લખોટા કિલ્લો ક્યા આવેલો છે ? - **જામનગર**

149. વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે? - **નર્મદા**

150. ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહેસાણા**

151. ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠકો ધરાવતો જિલ્લો ક્યો છે? - **ડાંગ**

152. ઈફ્કો લિમિટેડ કંપનીનું મથક કલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ગાંધીનગર**

153. નરસિંહ મહેતાએ પૂજા કરી હોય તેવું ઓપનાથ સ્થળ ક્યાં જિલ્લામાં છે? - **ભાવનગર**

154. શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભાળિયાનો જિલ્લો જણાવો. - **દેવભૂમિ દ્વારકા**

155. રાજપીપળાની ટેકરીઓમાંથી ક્યા પથ્થરો મળી આવે છે? - **અકીકના પથ્થરો**

156. ભગવાન મલ્લિનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહેસાણા**

157. બનાસકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા**

158. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભાલકાતીર્થ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ગીર સોમનાથ**

159. સ્વામીનારાયણ ધામ ગઢડા કઈ નદીના કિનારે વસેલું છે? - **ઘેલો**

160. ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ખેડા**

161. વખણાતી વઢીયારી ભેંસનો વિસ્તાર ક્યો છે? - **પાટણ**

162. જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **જૂનાગઢ**

163. કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર માતાનો મઢ ક્યા આવેલો છે? - **ગઢશીશા**

164. ભારતના 'દક્ષિણના કાશી' તરીકે પ્રસિદ્ધ ચાંદોદ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **વડોદરા**

165. સતલાસણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? - **મહેસાણા**

166. સૌથી વધુ દૂધાળા પશુઓ ક્યા જિલ્લામાં છે ? - **ખેડા**

167. ધોરાજી કિલ્લો ક્યા જિલ્લામાં આવેલો છે ? - **રાજકોટ**

168. પાટણ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર**

169. પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલીનો જિલ્લો જણાવો. - **સાબરકાંઠા**

170. આજવા ડેમ ક્યા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે ? - **વડોદરા**

171. ભવનાથ તળેટી ક્યા આવેલી છે ? - **જૂનાગઢ**

172. આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં છે? - **વલસાડ**

173. જામફળના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લાનું સ્થળ ? - **ધોળકા**

174. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **અમદાવાદ**

175. આખ્યાનના પિતા ભાલણનું જન્મ સ્થળ ક્યું છે? - **પાટણ**

176. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલું યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં છે ? - **કચ્છ**

177. ખેડા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા**

178. એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ક્યું છે? - **ભાવનગર**

179. ભાવી દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી ક્યા જિલ્લામાં આવેલી છે ? - **જામનગર**

180. મહાકાળી માતાનું મંદિર ક્યા ડુંગર પર આવેલું છે ? - **પાવાગઢ ડુંગર**

181. પવિત્ર તીર્થધામ કાયાવરોહણ સાથે ક્યો જિલ્લો જોડાયેલો છે ? - **વડોદરા**

182. રેલવે સુરક્ષા દળ (RPF)નું તાલીમ કેન્દ્ર ક્યા આવેલું છે ? - **વલસાડ**

183. ભૃગુ ઋષિનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ? - **ભરૂચ**

184. ઉપરકોટ કિલ્લો ક્યા આવેલો છે ? - **જૂનાગઢ**

185. નાના-મોટા ઉદ્યોગોથી ધમધમતું સ્થળ કડી ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહેસાણા**

186. રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં છે ? - **ખેડા**

187. ભારતના દક્ષિતના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **વડોદરા**

188. ગુજરાતના મીની કાશ્મીર તરીકે ક્યાં જિલ્લાને ઓળખાય છે ? - **નર્મદા**

189. સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **પાટણ**

190. આણંદ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **ખેડા, અમદાવાદ, ભરૂચ, વડોદરા**

191. હસનપીરની દરગાહ ક્યા આવેલી છે ? - **દેલમાલ**

192. અમદાવાદને કોણ ધૂળિયું શહેર કહેતું હતું ? - **જહાંગીર**

193. મુંદ્રા તાલુકો ગુજરાતના રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **કચ્છ**

194. ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યા થઈ હી ? - **અમદાવાદ (1826)**

195. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **પંચમહાલ**

196. કચ્છમાં ગૂગળ માટે ક્યું સ્થળ જાણીતું છે? - **માતાનો મઢ**

197. ભાભર તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **બનાસકાંઠા**

198. દરિયાકાંઠે આવેલું રમણીય સ્થળ અહમદપુર માંડવી ક્યા જિલ્લામાં છે ? - **ગીર સોમનાથ**

199. ગેટ વે ઓફ પોર્ટ તરીકે ઓળખાય ? - **હજીરા**

200. રાણી રૂડાબાઈએ બંધાવેલ બેનમૂન વાવ અડાલજનો જિલ્લો ક્યો છે ? - **ગાંધીનગર**

201. ખનીજેલ શુદ્ધિકરણ રિફાઈનરી કોયલી ક્યા આવેલી છે ? - **વડોદરા**

202. ભાવનગરના વિકાસ માટે ક્યા દિવાનને ઓળખાય છે ? - **સર પ્રભાશંકર પટ્ટણી**

203. જૂનો કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે ? - **સુરત**

204. વડોદરા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **આણંદ, ભરૂચ, નર્મદા, છોટ ઉદેપુર, પંચમહાલ, ખેડા**

205. ભારતભરમાં મશહુર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં છે? - **ભાવનગર**

206. ક્યા જિલ્લામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા ઠક્કરબાપા સરોવર બંધાયેલ છે ? - **દાહોદ જિલ્લો**

207. હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ તરીકે જાણીતું છે ? - **પાટણ**

208. લાકડાના કલાત્મક ફર્નિચરનું પ્રાપ્તી સ્થાન સંખેડા ક્યા જિલ્લામાં છે ? - **છોટા ઉદેપુર**

209. મહેમદાવાદ ખાતે ભમ્મરિયા કૂવાની રચના કરાવી હતી ? - **મહંમદ બેગડો**

210. ઈમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા ક્યા જિલ્લામાં છે ? - **ડાંગ**

211. અમરેલી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ**

212. જૈન પંચતીર્થમાંનું વિખ્યાત સ્થળ સુથરી ક્યા જિલ્લામાં આવેલું છે ? - **કચ્છ**

213. ગુજરાતમાં સુગંધોના શહેર તરીકે ઓળખાય છે ? - **પાલનપુર**

214. પીલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં આવેલો છે ? - **તાપી**

215. ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યું છે ? - **ધુવારણ**

216. સંત શ્રી મોરારીબાપુનું જન્મ સ્થળ તલગાજરડા ક્યા જિલ્લામાં છે ? - **ભાવનગર**

217. વલસાડ ક્યા જિલ્લા સાથે સરહદ બનાવતો એક માત્ર જિલ્લો છે? - **નવસારી**

218. પૌરાણિક નવલખા મંદિર નજીકનું સ્થળ ભાણવડ ક્યા જિલ્લામાં છે ? - **દેવભૂમિ દ્વારકા**

219. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે ? - **અંકલેશ્વર**

220. ચીનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢનો જિલ્લો ક્યો છે? - **સુરેન્દ્રનગર**

221. ગુજરાતના હૃદય તરીકે ક્યું શહેર ઓળખાય છે ? - **અમદાવાદ**

222. છોટા ઉદેપુર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **વડોદરા, નર્મદા, દાહોદ, પંચમહાલ**

223. ઓખા કિલ્લો ક્યા આવેલો છે ? - **દ્વારકા**

224. વડાલી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **સાબરકાંઠા**

225. પીઠોરાના જાણીતા ચિત્રો કઈ કોમ દ્વારા તૈયાર થાય છે ? - **રાઠવા**

226. પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં આવેલો છે ? - **તાપી**

227. પટારા બનાવવાનો ઉદ્યોગ ક્યા વિકસેલો છે ? - **ભાવનગર**

228. ડેસર તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **વડોદરા**

229. જામનગર ખાતે સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ? - **1967**

230. પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **વલસાડ**

231. નર્મદા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી**

232. વાઘબારી ક્યા આવેલી છે ? - **સાપુતારા**

233. પ્રાંતિજ તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ? - **સાબરકાંઠા**

234. દાંતા કઈ નદીના કિનારે વસેલું છે ? - **બનાસ**

235. 2009ના ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ હેઠળ પાટણના સાંતલપુરને વિકસાવાશે - **સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન**

236. આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન કોણે સેવ્યું હતું ? - **સરદાર પટેલ**

237. જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **રાજકોટ**

238. રાજકોટ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી**

239. પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાયનો જિલ્લો જણાવો. - **કચ્છ**

240. ગુજરાતનું ઓટોહબ એટલે ક્યું સ્થળ ? - **સાણંદ**

241. પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **સુરેન્દ્રનગર**

242. કોટાયર્ક સૂર્યમંદિરના અવશેષો પ્રાપ્ત થયેલા છે ? - **દહેગામ**

243. એકપણ ટાંકો લીધા વગરની રજાઈ સુજની માટે ક્યું સ્થળ જાણીતું છે ? - **ભરૂચ**

244. આઈના મહેલ ક્યા જોવા મળે ? - **ભૂજ**

245. અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **બનાસકાંઠા**

246. ભરૂચ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **નર્મદા, વડોદરા, આણંદ, સુરત**

247. કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ એટલે કયો જિલ્લો - **ભાવનગર**

248. આણંદ જિલ્લાના ઉત્તરસંડામાં ઉદ્યોગ વિકસેલો છે ? - **પાપડ ઉદ્યોગ**

249. નવલખા દરબારગઢ માટે જાણીતુ ગોંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **રાજકોટ**

250. ગુજરાતનું સૌથી મોટું ગંજબજાર ક્યું છે? - **ઊંઝા**

251. વિશાળ થર્મલ પાવર સ્ટેશન ધુવારણ ક્યા જિલ્લામાં છે ? - **આણંદ**

252. અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા અને છાત્રાલય ક્યા આવેલ છે? - **નારગોલ**

253. શંખેશ્વર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **પાટણ**

254. જૂનાગઢ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **રાજકોટ, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી**

255. કચ્છ જિલ્લામાં ક્યા મેદાનો આવેલા છે ? - **કંઠીનું અને વાગડનું મેદાન**

256. ચુડા તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **સુરેન્દ્રનગર**

257. ભરૂચ જિલ્લાના રતનપોરમાં ક્યા લોકોની વસાહત છે ? - **સીદી**

258. હારીજ તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **પાટણ**

259. નવલખા પેલેસ ક્યા શહેરમાં છે ? - **ગોંડલ**

260. અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત ક્યા જિલ્લામાં આવેલું છે ? - **આણંદ**

261. સુરત જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **ભરૂચ, નવસારી, તાપી, નર્મદા**

262. મહી નદીના કિનારાને પ્રાચીન સમયમાં કહેવાતું ? - **માહેય**

263. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા દ્વારા સ્થપાયેલી સંસ્થા કઈ છે ? - **દક્ષિણામૂર્તિ**

264. સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલો છે ? - **દાહોદ**

265. કુસુમવિલાસ પેલેસ ક્યા આવેલો છે ? - **છોટા ઉદેપુર**

266. પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહીસાગર**

267. આમલી અગિયારસનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે? - **દાહોદ**

268. નારેશ્વર ખાતેનો શ્રીરંગઅવધૂતનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ? - **વડોદરા**

269. માતા ભવાનીની વાવ ક્યા આવેલી છે ? - **અમદાવાદ**

270. પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ તીથલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **વલસાડ**

271. કાઠી ભરત અને મોચી ભરત માટે ક્યો જિલ્લો જાણીતો છે ? - **અમરેલી**

272. કુદરતી ગેસનું પ્રાપ્તી સ્થળ હજીરા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **સુરત**

273. ચોરઠ જોગણીનું મંદિર પોલાદર ક્યા જિલ્લામાં આવેલું છે? - **મહેસાણા**

274. મહત્ત્વનું શિપયાર્ડ ધરાવતું બંદર પીપાવાવનો જિલ્લો જણાવો. - **અમરેલી**

275. તાપી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **સુરત, નવસારી, ડાંગ, નર્મદા**

276. પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ભાવનગર**

277. બર્ડ સિટી (પક્ષી શહેર) કહેવાય ? - **પોરબંદર**

278. નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં છે ? - **સાબરકાંઠા**

279. આરઝી હકુમતની વડી કચેરી જૂનાગઢ હાઉસ ક્યા આવેલું છે? - **રાજકોટ**

280. રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ વાસંદા ક્યા જિલ્લામાં છે ? - **નવસારી**

281. બાવાગોરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? - **ભરૂચ**

282. માનગઢ ખાતે ક્યું વન આવેલું છે ? - **ગોવિંદ ગુરુ સ્મૃતિ વન**

283. દિગવીર નિવાસ પેલેસ ક્યા સ્થળે આવેલો છે ? - **વાંસદા**

284. તારંગા ખાતે ક્યુ વન આવેલું છે ? - **તીર્થંકર વન**

285. અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો કે અરવલ્લીની પૂછ એટલે કયો વિસ્તાર ? - **થલતેજ ટેકરા**

286. શ્યામલ વન ક્યા આવેલું છે ? - **શામળાજી**

287. વિજયનગર તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **સાબરકાંઠા**

288. નવસારી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **સુરત, વલસાડ, ડાંગ, તાપી**

289. ગુજરાત સરહદની છેલ્લી ચેકપોસ્ટ કઈ ગણાય છે? - **ભીલાડ**

290. ગાંધીજીએ શિક્ષણ મેળવ્યું હોય તેવી શામળદાસ કોલેજ આવેલી છે ? - **ભાવનગર**

291. ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહિસાગર**

292. વિજાપુર તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **મહેસાણા**

293. વડનગર જેવું અન્ય તોરણ મહેસાણા જિલ્લાના ક્યા ગામે છે? - **પિલુદ્રા**

294. સાગબારા તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે ? - **નર્મદા**

295. ગંગાસર સરોવર ક્યા આવેલું છે? - **વિરમગામ**

296. કપરાડા તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે ? - **વલસાડ**

297. પોરબંદરનું બાયોવિલેજ ગામ ક્યું છે ? - **મોછા**

298. સરસ્વતી તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે ? - **પાટણ**

299. મકરપુરા પેલેસ ક્યા શહેરમાં છે ? - **વડોદરા**

300. બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાન રણુજા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **રાજકોટ**

301. ડાંગ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **તાપી, નવસારી**

302. સાત નદીઓનું સંગમ સ્થળ વૌઠા આવેલું છે. - **અમદાવાદ**

303. માધાવાવ ક્યા આવેલ છે ? - **વઢવાણ**

304. કવિ કલાપીની કર્મભૂમિ લાઠી આવેલું છે. - **અમરેલી**

305. ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું અમદાવાદમાં જગન્નાથ મંદિર ક્યા વિસ્તારમાં આવેલું છે? - **જમાલપુર**

306. જમિયલાશાપીરની પવિત્ર દરગાહ ક્યા આવેલી છે ? - **દાતાર**

307. દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર આવેલું છે. - **રાજકોટ**

308. ભાવનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **અમદાવાદ, બોટાદ, અમરેલી**

309. ગુજરાત રાજયમાં આવેલ જિલ્લાઓની કુલ સંખ્યા જણાવો. - **33**

310. પાલિતાણાનો શેત્રુંજય પર્વત ક્યા તીર્થકરનું સ્થાનક છે ? - **ઋષભદેવ**

311. ધનસુરા તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે? - **અરવલ્લી**

312. સૌરાષ્ટ્રની આન,બાન,શાન એટલે ? - **રાજકોટ**

313. ગુજરાત રાજયના સુરત જિલ્લાને હદને ક્યા જિલ્લાઓની હદ સ્પર્શે છે ? - **નવસારી, તાપી, નર્મદા, ભરૂચ**

314. તણછાઈ કાપડમાં ક્યો જિલ્લો વિશેષતા ધરાવે છે? - **સુરત**

315. ગુજરાત રાજયમાં આવેલ બોટાદ જિલ્લાને ક્યાં તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે? - **ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ**

316. બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે ? - **શંખોદ્વાર બેટ**

317. મહેસાણા જિલ્લો અન્ય ક્યાં જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા**

318. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **કચ્છ**

319. ક્રિભક ભારી કો. ઓપરેટિવ લિ.નું કારખાનું ક્યા આવેલું છે ? - **સુરત**

320. આદ્યકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ક્યા જિલ્લામાં છે? - **ભાવનગર**

321. દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે ક્યો જિલ્લો જાણીતો છે ? - **વલસાડ**

322. કેલ્સાઈટ જથ્થાનો વિસ્તાર પનાલા ડિપોઝીટ ક્યા જિલ્લામાં છે? - **જૂનાગઢ**

322. ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું માધવપુર સ્થળ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **પોરબંદર**

323. અંતરિક્ષ યારી સુનીતા વિલિયમ્સનું વતન ઝુલાસણ ક્યા જિલ્લામાં છે ? - **મહેસાણા**

324. ગીર-સોમનાથ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **અમરેલી, જૂનાગઢ**

325. નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **બોટાદ**

326. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યો છે? - **વઘઈ બોટનિકલ ગાર્ડન**

327. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું છે ? - **સરકલાની ટેકરીઓ**

328. વઢવાણ તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **સુરેન્દ્રનગર**

329. મક્કાના પ્રવેશદ્વાર તરીકે ક્યું બંદર જાણીતું છે ? - **સુરત**

330. દાંતીવાડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **બનાસકાંઠા**

331. ભૂવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ? - **ગોંડલ**

332. આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **વલસાડ**

333. સાબરકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી**

334. ગળી માટે અમદાવાદ જિલ્લાનું સ્થળ જાણીતું છે ? - **સરખેજ**

335. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક....... - **ખંભાળિયા**

336. સહકારી મંડળીઓની પ્રવૃત્તિ માટે ક્યું સ્થળ જાણીતું છે ? - **વાલોડ**

337. ફતેહપુરા તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **દાહોદ**

338. સાવલી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **વડોદરા**

339. સતિયાદેવ પર્વત ક્યા જિલ્લામાં છે ? - **જામનગર**

340. દેવગઢબારીયા તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **દાહોદ**

341. મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? - **પુષ્પાવતી**

342. માળીયા હાટીના તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **જૂનાગઢ**

343. ભચાઉ તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **કચ્છ**

344. નવલખા દરબારગઢ માટે જાણીતું ગોંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **રાજકોટ**

345. જીરણગઢ શહેરની અન્ય ઓળખ છે ? - **જૂનાગઢ**

346. ગાંધીનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ખેડા, અરવલ્લી**

347. દિલબહારનગરી તરીકે ક્યા શહેરને ઓળખાય છે? - **સુરત**

348. પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહીસાગર**

349. કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલા બંધ છે? - **મહિ નદી**

350. હડપ્પા સંસ્કૃતિનું સુવિખ્યાત સ્થળ ધોળાવીરા સાથે ક્યો જિલ્લો સંકળાયેલો છે ? - **કચ્છ**

351. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે ? - **સોમનાથ**

352. વલસાડી સાગમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બીલીમોરા ક્યા જિલ્લામાં છે ? - **નવસારી**

353. દાંડીકૂચ પશ્ચાત ગાંધીજીની ધરપકડ ક્યા ગામેથી થઈ હતી ? - **કરાડી**

354. વર્ષ 2009ના ગુજરાત ખાસ મૂડી રોકાણ પ્રદેશ અધિનિયમ અન્વયે ધોલેરાને ક્યા રીજિયન તરીકે વિકસાવાઈ રહ્યો છે ? - **સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન**

355. સતી રાણકી દેવીનું મંદિર આવેલું છે? - **વઢવાણ**

356. ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ ખાતે વિકસ્યો છે. અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ભાવનગર**

357. ગુજરાતનો સૌથી મોટો દરિયાખાનનો ઘુમ્મટ આવેલો છે ? - **અમદાવાદ**

358. ગુજરાતમાં ક્યા સ્થળે સૌથી વહેલો સૂર્યોદય થશે ? - **દાહોદ**

359. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી પસાર થાય ? - **કર્કવૃત્ત**

360. જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **કચ્છ**

361. અરવલ્લી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર**

362. કોડીનાર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **ગીર સોમનાથ**

363. ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર ક્યું છે ? - **સુરત**

364. પ.પૂ.બજરંગદાસ બાપાનું આશ્રમ સ્થળ બગદાણા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ભાવનગર**

365. એસ્સાર ઓઈલની જાણીતી કંપની વાડીનાર ક્યા જિલ્લામાં છે? - **જામનગર**

366. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **કચ્છ**

367. ગુજરાતનું છેલ્લું રેલવે સ્ટેશન ઉમરગામ ક્યા જિલ્લામાં છે? - **વલસાડ**

368. ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે? - **ભાવનગર**

369. નવસારી કઈ નદીના કિનારે વસેલું છે? - **પૂર્ણા**

370. 'કાળિયાર' માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાના ક્યા તાલુકામાં આવેલો છે ? - **વલભીપુર**

371. પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે? - **બોટાદ**

372. મહીસાગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ**

373. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈંસ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ? - **ભાવનગર**

374. ક્યા શહેરમાં આવેલા ધી ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન જાહેર કરાયેલ છે? - **ભરૂચ**

375. બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર ક્યા આવેલ છે ? - **પ્રાંતિજ**

376. મોઢેરા ખાનેતું સૂર્યમંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **મહેસાણા**

377. અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નામ શું છે ? - **નરસિંહ મહેતા તળાવ**

378. અમદાવાદ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર**

379. રિલાયન્સ ઓઈલ રિફાઈનરીનું કેન્દ્ર મોટી ખાવડી ક્યા જિલ્લામાં આવેલું છે ? - **જામનગર**

380. ભગતનું ગામ એટલે સાયલા તે ભગત કોણ ? - **લાલજી ભગત**

381. સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રાધામ ગઢડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - **બોટાદ**

382. 1964થી સતત રામધૂન ચાલતી હોય તેવું બાલા હનુમાન મંદિર આવેલું છે? - **જામનગર**

383. પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગનો જિલ્લો જણાવો. - **દેવભૂમિ દ્વારકા**

384. એશિયામાં માનવસર્જિત યાર્નનું સૌથી મોટું માર્કેટ ક્યા આવેલું છે? - **સુરત**

385. પ્રસિદ્ધ સ્થળ માલસામોટ ક્યા જિલ્લામાં આવેલું છે ? - **ભરૂચ**

386. પક્ષીવિદ્દોની આંગણવાડી કહેવાય ? - **નળ સરોવર**

387. ધાનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **દાહોદ**

388. દાહોદ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર**

389. શિવરાત્રી નિમિત્તે દિગંબર સાધુઓ નહાવા પડે તે કુંડ ક્યો છે? - **મૃગિકુંડ**

390. પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સતાધાર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **જૂનાગઢ**

391. વાઘોડિયા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? - **વડોદરા**

392. સાપુતારા શબ્દનો અર્થ શું થાય ? - **સાપનો નિવાસ**

393. પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ ભાડભુત આવેલું છે. - **ભરૂચ**

394. અમદાવાદ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે ? - **નાનુભાઈ શાહ**

395. સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું વઢવાણ ક્યા જિલ્લામાં છે ? - **સુરેન્દ્રનગર**

396. સુરેન્દ્રનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **અમદાવાદ, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ**

397. એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે ? - **સાસણગીર**

398. પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સતાધાર ક્યા જિલ્લામાં આવેલું છે ? - **જૂનાગઢ**

399. મેશ્વો નદીના કિનારે આવેલું તીર્થસ્થળ ક્યું છે? - **શામળાજી**

400. ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે ? - **વડોદરા**

401. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા ક્યા જિલ્લામાં છે ? - **તાપી**

402. પંચમહાલ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **દાહોદ, મહીસાગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર**

403. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે ? - **જામનગર**

404. અદ્‌ભૂત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક - કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ? : **બનાસકાંઠા**

405. એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યા આવેલું હતું ? - **ભાવનગર**

406. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? : **મોરબી**

407. ગુજરાતમાં સૌથી ઝડપી વિકાસ પામતું શહેર કહેવાય ? - **સુરત**

408. ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? : **કચ્છ**

409. વલસાડ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **નવસારી**

410. નારાયણદેવનું પવિત્ર સ્થાનક બોરસદ ક્યા જિલ્લામાં આવેલું છે ? : **આણંદ**

411. કચ્છમાં કોટાય સૂર્યમંદિર બંધાવ્યું હતુ ? - **કાઠીઓ**

412. પાલનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? : **બનાસકાંઠા**

413. પોરબંદર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા**

414. નિષ્કલંક માતાનું પવિત્ર ધામ ક્યા જિલ્લામાં આવેલું છે ? : **વડોદરા**

415. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્રની શરૂઆત ક્યા શહેરમાં થઈ હતી ? - **વડોદરા**

416. નવસારીમાં પૂર્ણા નદીનો પ્રવેશ ક્યાંથી થાય છે? - **કુરેલ ગામ**

417. વિસનગર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **મહેસાણા**

418. સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યા આવેલું છે ? - **અમદાવાદ**

419. પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલી ક્યા જિલ્લામાં આવેલું છે ? : **સાબરકાંઠા**

420. બોટાદ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર**

421. ગોધરા ક્યા કાળમાં જાણીતું ઉદ્યોગ કેન્દ્ર હતું ? - **મરાઠાકાળ**

422. લાખાણી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **બનાસકાંઠા**

423. પટોળામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે ? - **બેવડી ઈક્કત શૈલી**

424. વાવ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **બનાસકાંઠા**

425. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો ક્યો છે? - **દાહોદ**

426. પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય ક્યા જિલ્લામાં આવેલું છે ? : **કચ્છ**

427. પૌરાણિક શિવમંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ ક્યા જિલ્લામાં આવેલું છે? : **વડોદરા**

428. દેવભૂમિ-દ્વારકા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **પોરબંદર, જામનગર**

429. નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **કચ્છ**

430. તાપી નદીના કિનારાને શું કહેવાય છે? - **કરોડો સુવાલીની ટેકરીઓ**

431. ધાતુને ઓગાળવા કઈ ખનિજ ઉપયોગી છે ? - **ફ્લોરસ્પાર**

432. નગર ગાયિકાઓ તાના-રીરીનું જન્મસ્થળ વડનગર ક્યા જિલ્લામાં આવેલું છે ? : **મહેસાણા**

433. સમી તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે ? : **પાટણ**

434. ડીસા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **બનાસકાંઠા**

435. સિરક્રિકને અન્ય ક્યા નામે ઓળખાય છે? - **બાણગંગા**

436. જામનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **દેવભૂમિ-દ્વારકા, જામનગર**

437. 'નાના અંબાજી'ના નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં આવેલું છે ? : **સાબરકાંઠા**

438. ડાંગનું પ્રવેશદ્વારા કહેવાય ? - **વઘઈ**

439. પારસી ભાઈઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ? : **વલસાડ**

440. સૌથી પ્રાચીન મંદિર ક્યું છે? - **ગોરજ**

441. નસવાડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **છોટા ઉદેપુર**

442. ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? : **દાહોદ**

443. કંજેટા મધ માટે ક્યું સ્થળ જાણીતું છે ? - **લીમખેડા**

444. મોરબી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - **જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ**

445. **માતૃશ્રાદ્ધ માટે જાણીતું સરોવર ક્યું છે? - બિંદુ સરોવર**

446. કચ્છના ગરીબનવાઝ તરીકે ઓળખવામાં આવે છે ? - **હાજીપીર**

447. આઝાદીની લડાઈમાં 'સરદારનું' માનીતું સ્થળ બારડોલી ક્યા જિલ્લામાં આવેલું છે ? : **સુરત**

ભારતની ભૂગોળ

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. રોહલા નેશનલ પાંર્ક ક્યા રાજ્યમાં આવેલ છે ?
A) હિમાચલ પ્રદેશ B) આસામ C) કર્ણાટક D) રાજસ્થાન

રેવન્યૂ તલાટી - 28/02/2016

2. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન	1) કર્ણાટક
b) હમ્પી સ્મારક સમૂહ	2) ઓરિસ્સા
c) સૂર્યમંદિર, કોણાર્ક	3) પશ્ચિમ બંગાળ
d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન	4) રાજસ્થાન

A) b-1, d-4, c-2, a-3 B) a-1, c-3, b-2, d-4
C) a-4, d-3, c-1, b-2 D) b-1, c-3, a-4, d-2

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

3. 'Menmecho Lake'નામની પર્વતમાળા ક્યા રાજ્યમાં આવેલી છે ?
A) સિક્કિમ B) આસામ C) ત્રિપુરા D) હિમાચલ પ્રદેશ

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

4. બનારસ શહેરનું જૂનું નામ શું ?
A) રાજગીર B) પટણા C) કાશી D) અયોધ્યા
5. ભારતની સૌથી લાંબી નદી કઈ ?
A) બ્રહ્મપુત્રા B) સરસ્વતી C) ગંગા D) યમુના

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

6. ભારતના ક્યા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?
A) મિઝોરમ B) આસામ
C) સિક્કિમ D) અરુણાચલ પ્રદેશ
7. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?
A) છ B) આઠ C) સાત D) પાંચ
8. પુલિકટ સરોવર ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે ?
A) આંધ્ર પ્રદેશ B) ઓરિસ્સા C) રાજસ્થાન D) તેલંગાણા

GPSC પેપર - 1 - 2017

9. ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે?
A) બાંગ્લાદેશ B) ભૂતાન C) નેપાળ D) મ્યાનમાર
10. સિન્ધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત .... નદીઓ પર અલાયદા હક્કોની વહીવટ કરે છે.
1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ
4. સિંધુ 5. સતલજ 6. જેલમ
A) ફક્ત 1, 2 અને 3 B) ફક્ત 1, 3 અને 4
C) ફક્ત 2, 3 અને 5 D) ફક્ત 1, 2 અને 6

GPSC પેપર - 2 - 2017

11. જમ્મુ અને કાશ્મિરના ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ?
A) NH 44 B) NH 45 C) NH 46 D) NH 47
12. ભારતમાલા પ્રોજેક્ટ શું છે ?
A) ફ્લોરિકલ્ચર ડેવલપમેન્ટ મિશન
B) પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેકટ
C) નદીઓને જોડતો કાર્યક્રમ
D) ઉપરના પૈકી કોઈ નહીં
13. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે.
A) જૂન - જુલાઈ B) ઓક્ટોબર - નવેમ્બર
C) મે - જૂન D) માર્ચ - એપ્રિલ
14. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001-2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ?
A) ઉત્તરપ્રદેશ B) મહારાષ્ટ્ર C) બિહાર D) આંધ્રપ્રદેશ
15. નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ?
A) ગંડક B) કોસી C) શારદા D) તીસ્તા
16. લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ?
A) એલ્યુમિનિયમ સંયોજનો B) આઈરન ઓક્સાઈડ
C) જસત સંયોજનો D) કોપર ઓક્સાઈડ
17. ભારતમાં નીચેના પૈકી ક્યું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?
A) મન્નારનો અખાત B) ખંભાતનો અખાત
C) કચ્છનો અખાત D) ચિલ્કા સરોવર

1)A, 2)A, 3)A, 4)C, 5)C, 6)A, 7)B, 8)A, 9)C, 10)C, 11)A, 12)B, 13)B, 14)B, 15)C, 16)B, 17)B.

18. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?
A) કેરળ - મિઝોરમ - ત્રિપુરા - ગોવા
B) કેરળ - ગોવા - ત્રિપુરા - મિઝોરમ
C) મિઝોરમ - કેરળ - ગોવા - ત્રિપુરા
D) ગોવા - કેરળ - મિઝોરમ - ત્રિપુરા

19. નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર (Catchment area) છે ?
A) નર્મદા B) તાપી C) મહાનદી D) ગોદાવરી

20. નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ?
A) આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ
B) મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન
C) કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ
D) હરિયાણા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ

21. નીચેના પૈકી ક્યા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી ?
A) કોલસો (Coal) B) માટીના ખડક (Shale)
C) ચૂનો (Limestone) D) ચોક (Chalk)

22. કાંપની જમીન શેના દ્વારા બને છે ?
A) જ્વાળામુખી B) ખવાણ
C) વહેતા પાણી દ્વારા નિક્ષેપણ D) વનસ્પતિ અને પ્રાણીઓ

23. પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agriculture) ક્યા રાજ્યમાં નોંધપાત્ર છે ?
A) હિમાચલ પ્રદેશ B) કર્ણાટક
C) મિઝોરમ D) ઝારખંડ

24. નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ?
A) ગુજ્જર B) ભીલ C) સાંથલ D) ગોન્ડ

25. નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.
A) મહાનદી - નર્મદા - યમુના - કાવેરી
B) નર્મદા - મહાનદી - કાવેરી - યમુના
C) યમુના - નર્મદા - મહાનદી - કાવેરી
D) નર્મદા - યમુના - કાવેરી - મહાનદી

26. મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ) - કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ?
A) વંટાળનો વરસાદ B) ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ
C) ઉષ્ણતાનયનનો વરસાદ D) વાતાગ્રનો વરસાદ

27. નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron Ore) મેળવે છે ?
A) વિશાખાપટ્ટનમ્ B) રાઉરકેલ્લા
C) ભદ્રાવતી D) ભીલાઈ

28. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ?
A) ગુજરાત B) કેરળ C) તામિલનાડુ D) મહારાષ્ટ્ર

29. ભારતમાં નીચેના પૈકી ક્યા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ?
A) પશ્ચિમ બંગાળ B) ગુજરાત C) મહારાષ્ટ્ર D) કર્ણાટક

30. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે ?
A) 6 B) 7 C) 8 D) 9

31. તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?
A) ગંગા-સરસ્વતી B) ગંગા-યમુના
C) કૃષ્ણા-ગોદાવરી D) નર્મદા-તાપી

32. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી ક્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ?
A) ચંદીગઢ B) દમણ અને દીવ
C) પુડુચેરી D) લક્ષદ્વિપ

GPSC MAINS પેપર - 1 - 2016

33. 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતા ત્રણ રાજ્યો ક્યા છે ?
A) ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ
B) ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર
C) ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ
D) ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ

34. 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ?
A) 1.40 % B) 1.76 % C) 1.90 % D) 2.10 %

GPSC MAINS પેપર - 2 - 2016

35. ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ?
A) તુતીકોરીન, તમિલનાડુ B) લાંબા, ગુજરાત
C) નાગપુર, મહારાષ્ટ્ર D) પણજી, ગોવા

36. પ્લાયા (Playa)નું વૈકલ્પિક નામ
A) કરાડ B) સૂકું તળાવ (Dry Lake)
C) મુખ ત્રિકોણ D) પર્વતો

37. શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ?
A) જુવાર B) એરંડા C) કપાસ D) મકાઈ

18)A, 19)D, 20)B, 21)B, 22)C, 23)C, 24)A, 25)C, 26)B, 27)C, 28)C, 29)B, 30)C, 31)B, 32)D, 33)B, 34)B, 35)A, 36)B, 37)C.

38. ગ્રાન્ડ નાઈન (G9- Grand Nine) નીચેના પૈકી ક્યા પાકની જાત છે ?

A) કેળા B) મકાઈ C) જામફળ D) ચીકું

39. ક્યા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

A) કર્કવૃત્ત B) મકરવૃત્ત

C) વિષુવવૃત્ત D) 90^0 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ

40. ભારતીય દ્વિપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા ક્યા આવેલું છે?

A) તિરુમાલા ટેકરીઓ B) મહાદેવ ટેકરીઓ

C) નીલગીરી ટેકરીઓ D) સાતપુડા ગિરિમાળા

41. વિષુવવૃત્તીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે ?

A) ઝેયર તટપ્રદેશ B) ઈન્ડોનેશીયા તટપ્રદેશ

C) ભારતીય વૃત્તો D) એમેઝોન તટપ્રદેશ

42. એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાહ નીચેના પૈકી ક્યા મહાસાગરનો છે ?

A) એન્ટાર્કટિકા મહાસાગર B) પેસિફિક મહાસાગર

C) હિંદ મહાસાગર D) આર્કટિક મહાસાગર

43. નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઈઝેશન (NATMO) ક્યા આવેલ છે ?

A) મુંબઈ B) કોલકાતા C) હૈદરાબાદ D) નવી દિલ્હી

44. ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે

A) દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી

B) દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી

C) કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી

D) દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી

45. ભારતમાં નીચેના પૈકી ક્યુ રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ?

A) અરુણાચલ પ્રદેશ B) ગુજરાત

C) મધ્ય પ્રદેશ D) આસામ

46. નીચે પૈકી કઈ કેરીની જાત નથી ?

A) જમાદાર B) દશેરી C) કાલીપત્તી D) નીલમ

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

47. વિંધ્ય ખંડકર્તત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે ?

A) ગુજરાત B) રાજસ્થાન C) મધ્ય પ્રદેશ D) મહારાષ્ટ્ર

48. કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે?

A) નલ્લામલા ટેકરીઓ B) શેવરોય ટેકરીઓ

C) પાલકોંડા ટેકરીઓ D) કોંડાવિડુ ટેકરીઓ

49. સુબણસિરી, કામેંગ અને સંકોસ એ કઈ નદીની સહાયક નદીઓ છે ?

A) ગંડક B) બ્રહ્મપુત્રા C) રીંગીત D) કોસી

50. નીચે પૈકી ક્યું સરોવર જ્વાળામુખી સરોવરનું દૃષ્ટાંત છે ?

A) પોન્ગોંગ ત્સો B) વૂલર

C) લોનાર D) ત્સો-મોરીરી

51. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે?

A) દહેરાદૂન B) ભોપાલ C) નૈનીતાલ D) પૂણે

52. ભારતમાં મેન્ગ્રૂવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રૂવ ક્ષેત્રના કેટલા ટકા છે ?

A) 5 B) 7 C) 6 D) 8

53. રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?

A) કૃષ્ણા B) ઘાટપ્રભા C) ગોદાવરી D) તુંગભદ્રા

54. 'લૂ'એ ક્યા પ્રકારનો પવન છે ?

A) સ્થાયી B) મૌસમી પવન

C) સ્થાનિક પવન D) એકપણ નહી

55. દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ?

A) પ્રથમ B) બીજો C) ત્રીજો D) પાંચમો

56. બાલ્ફાક્રમ નેશનલ પાર્ક ક્યા આવેલ છે ?

A) મેઘાલય B) પશ્ચિમ બંગાળ C) કેરાલા D) તમિલનાડુ

57. સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?

A) દિલ્હી B) કલકત્તા C) હૈદરાબાદ D) ચેંગાલપટ્ટુ

58. એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી ક્યા શહેરમાં નથી ?

A) દિલ્હી B) મુંબઈ C) લુધિયાણા D) બેંગલોર

PSI GK - 1/1/2017

59. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

A) કાવેરી B) બ્રહ્મપુત્ર C) કૃષ્ણા D) ગંગા

60. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

A) કન્યાકુમારી B) લક્ષ્ય પોઈન્ટ

C) ઈન્દિરાપોઈન્ટ D) પોક પોઈન્ટ

61. ક્યા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ?

A) મધ્ય પ્રદેશ B) રાજસ્થાન C) દિલ્હી D) ઉત્તર પ્રદેશ

62. ભારત..............ની વચ્ચે આવે છે.

A) $8^04'$ N અને $37^06'$N અક્ષાંશ

B) $23^03'$ N અને $62^01'$N અક્ષાંશ

C) 1^0 N અને $29^04'$N અક્ષાંશ

D) $17^05'$ N અને $53^02'$ N અક્ષાંશ

38)A, 39)C, 40)C, 41)D, 42)C, 43)B, 44)A, 45)C, 46)C, 47)B, 48)D, 49)B, 50)C, 51)B, 52)B, 53)C, 54)C, 55)A, 56)A, 57)D, 58)D, 59)C, 60)C, 61)D, 62)A.

63. 2011 વસતી ગણતરી મુજબ ભારતની વસતી ગીચતા કેટલી હતી?
A) 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
B) 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
C) 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
D) 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

64. ....થી કર્કવૃત પસાર થતો નથી.
A) રાજસ્થાન B) છત્તીસગઢ C) ઓડિશા D) ત્રિપુરા

65. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio)ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ?
A) 1951 B) 1961 C) 1941 D) 1971

PSI GK - 4-3/5-3/2017

66. ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ?
A) 62.50 પૂર્વ રેખાંશ B) 72.50 પૂર્વ રેખાંશ
C) 82.5^0 પૂર્વ રેખાંશ D) 92.50 પૂર્વ રેખાંશ

67. 2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ?
A) 10 % થી ઓછો B) 10 % - 15 % થી ઓછા
C) 15 % થી 20 % ની વચ્ચે D) 20 % થી વધુ

68. નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?
A) દાદરા અને નાગર હવેલી
B) દમણ અને દીવ
C) આંદામાન અને નિકોબાર ટાપુઓ
D) લક્ષદ્વીપ

કોન્સ્ટેબલ - 23/10/2016

69. ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?
A) પ્રસ્તર B) રૂપાંતરિત C) સેન્દ્રિય D) આગ્નેય

70. 'ભારતનો સંત્રી' એટલે શું ?
A) હિંદ મહાસાગર B) કચ્છનો અખાત
C) અરવલ્લી પર્વત D) હિમાલય પર્વત

71. ક્યા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે ?
A) વારાણસી B) અલ્હાબાદ C) કોલકત્તા D) પટણા

કોન્સ્ટેબલ - 2015

72. નીચેનામાંથી ક્યા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P) જમ્મુ અને કાશ્મીર Q) સિક્કિમ
R) અરુણાચલ પ્રદેશ S) હિમાચલ પ્રદેશ
A) P, R અને S B) P, Q અને R
C) P અને R D) P, Q, R અને S

73. જોડકા જોડો.
P) અરુણાચલ પ્રદેશ 1) દિસપુર
Q) આસામ 2) ઈટાનગર
R) ગોવા 3) રાંચી
S) ઝારખંડ 4) પણજી
A) P-1, Q-2, R-4, S-3 B) P-2, Q-1, R-4, S-3
C) P-3, Q-4, R-1, S-2 D) P-4, Q-3, R-2, S-1

74. ભારતનું ક્યું નવું રાજ્ય-2014માં બન્યું ?
A) છત્તીસગઢ B) તેલંગાણા C) ઝારખંડ D) ઉત્તરાખંડ

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

75. ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ ક્યા રાજ્યની હદ સાથે મળતી નથી ?
A) ઓરિસ્સા B) મહારાષ્ટ્ર C) તમિલનાડુ D) કર્ણાટક

GPSC પ્રિલિમ - 2001

76. ભારતમાં કેસર (કેરી નહીં)ની ખેતી ક્યા થાય છે ?
A) ઉત્તર પ્રદેશ B) કર્ણાટક
C) ગુજરાત D) જમ્મુ-કાશ્મીર

GPSC પ્રિલિમ - 2007

77. દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી ક્યા રાજ્યમાં થાય છે?
A) હિમાચલ B) મહારાષ્ટ્ર C) કર્ણાટક D) પંજાબ

78. અફીણની ખેતી ક્યાં થાય છે ?
A) ઉત્તર પ્રદેશ B) બંગાળ C) આસામ D) કર્ણાટક

79. નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે ?
A) ગંગા B) બ્રહ્મપુત્રા C) ગોદાવરી D) યમુના

80. તિરુવઅનંતપુરમનું જુનું નામ શું હતું ?
A) તિરુનેલવેલી B) ત્રિચુર C) ત્રિવેન્દ્રમ D) તિરુપતિ

81. મુનાર હિલસ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ?
A) હિમાલય B) કેરળ C) આસામ D) કર્ણાટક

82. કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
A) કોફી B) કાજુ C) લવિંગ D) ચા

83. ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?
A) રાવી B) ઝેલમ C) સતલજ D) બિયાસ

84. માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી ક્યું શહેર જાણીતું છે ?
A) શિવાકાશી B) કોઈમ્બતુર C) માયસોર D) પોંડિચેરી

85. નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે ?
A) યુકેલિપ્ટસ B) દેવદાર C) બાવળ D) આસોપાલવ

63)D, 64)C, 65)B, 66)C, 67)C, 68)D, 69)D, 70)D, 71)B, 72)D, 73)B, 74)B, 75)C, 76)D, 77)B, 78)A, 79)B, 80)C, 81)B, 82)A, 83)C, 84)C, 85)A.

86. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ?
A)બંગાળ B)આસામ C)બિહાર D)ઓરિસ્સા

GPSC પ્રિલિમ - 2014

87. ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ?
A)સાતપુડિયા મધમાખી B) ભૂગા મધમાખી
C)ડમ્મર મધમાખી D)ભમરિયા મધમાખી

88. માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?
A)ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
B) પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે
C)કુદરતી આપદા પ્રબંધન માટે
D)સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે

89. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની વસતી કેટલી છે?
A)951 B)940 C)937 D)967

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

90. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલો છે?
A)ઉત્તરપ્રદેશ B)છત્તીસગઢ C) મધ્યપ્રદેશ D)ઝારખંડ

91. કેરળ રાજયમાં કયું અભયારણ્ય આવેલું છે?
A)પેરીયાર B)માનસ C)દચિગામ D)મદુમલાઈ

92. કસ્તૂરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે?
A)કોર્બેટ B)કાઝીરંગા C)બાંદીપુર D)દચિગામ

93. ભારતમાં એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ શું છે?
A)બેરન B)નારકોન્ડમ C)એટોલ D)કોરોમંડલ

94. નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે?
A)એકશિંગી ભારતીય ગેંડા B)ડુગોંગ
C)ઓક્ટોપસ D)કસ્તુરીમૃગ

95. ઝારખંડ રાજયોમાં આવેલા ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી?
A)લિંગદોહ B)ઓરન C)પલામુ D)સરના

PSI/ASI GK - 2/5/2015

96. ક્યા રાજયમાં તાંબાનો મોટો ભંડાર છે ?
A)ઝારખંડ B)ગુજરાત C)રાજસ્થાન D)છત્તીસગઢ

97. હૈદ્રાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ?
A)મૂસી B)તુંગભદ્રા C)ગોદાવરી D)મહી

98. દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઈ છે ?
A)નર્મદા B)ગોદાવરી C)કાવેરી D)કૃષ્ણા

99. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે ?
A)મધ્યપ્રદેશ B)બિહાર C)રાજસ્થાન D)ઉત્તરપ્રદેશ

100. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ?
A)લોખંડ B)કપાસ C)ખાતર D)ખનિજ તેલ

GPSC Class-1 - 2016

101. 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે?
A)દક્ષિણધ્રુવવૃત્ત B) વિષુવવૃત્ત
C)મકરવૃત્ત D)કર્કવૃત્ત

102. ભારતમાં નીચેના પૈકી કયા રાજયમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે ?
A)બિહાર B)અસમ C)પશ્ચિમ બંગાળ D) ત્રિપુરા

103. ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજયમાં જોવા મળે છે ?
A)બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ
B)ઝારખંડ, ઓડિશા અને કર્ણાટક
C)બિહાર, ઝારખંડ અને ગોવા
D)ઓડિશા, છત્તીસગઢ અને મિઝોરમ

104. ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ?
A)ઝેલમ B)ચિનાબ C)રાવી D)બિયાસ

105. બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?
A)6 કલાક 25 મિનિટ B)9 કલાક 25 મિનિટ
C)12 કલાક 25 મિનિટ D)24 કલાક 25 મિનિટ

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

106. દેશમાં સેક્સ રેશીયો (દર 1000 પુરૂષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજયમાંથી સૌથી વધારે છે? (2011 ની વસ્તી ગણત્રીના આધારે)
A)ગોવા B)કેરળ C)ગુજરાત D)ઉત્તરાખંડ

107. ભારતમાં કયા રાજયમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of Population) સૌથી ઓછી છે?
A)સિક્કીમ B)મેઘાલય C)મિઝોરમ D)અરૂણાચલ પ્રદેશ

108. સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે?
A)બે (2) B)ત્રણ (3) C)ચાર (4) D)પાંચ (5)

109. હાલમાં હિતુપુર ડાયમન્ડ બ્લોકની હરાજી કરવામાં આવી. આ બ્લોક કયા રાજયમાં આવેલો છે?
A)આંધ્રપ્રદેશ B)મધ્યપ્રદેશ C)ઉત્તરપ્રદેશ D)મેઘાલય

86)B, 87)A, 88)B, 89)B, 90)C, 91)A, 92)D, 93)A, 94)A, 95)D, 96)C, 97)A, 98)B, 99)D, 100)D, 101)D, 102)C, 103)B, 104)A, 105)C, 106)B, 107)D, 108)C, 109)B.

GPSC Class - 2 - 29/1/2017

110. લક્ષદ્વિપ ટાપુઓ કયા આવેલા છે?
A) હિંદ મહાસાગર B) અરબસાગર
C) બંગાલનો ઉપસાગર D) ઉપર પૈકી એકપણ નહી

111. ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે?
A) અરવલ્લી B) હિમાલય
C) શિવાલિક
D) ઉપર દર્શાવેલ ત્રણેય પર્વતમાળાઓ

112. નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?
A) લાલ મરચાં - આંધ્રપ્રદેશ B) કેસર - જમ્મુ કાશ્મીર
C) આદુ - સિક્કીમ D) કુદરતી રબ્બર - કેરલા

113. જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી?
A) મધ્યપ્રદેશ B) બિહાર
C) ઉત્તરપ્રદેશ D) જમ્મુ અને કાશ્મીર

114. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.

ધાતુઓ	વિસ્તાર
A) સોનુ	1) ખેત્રી
B) કોલસો	2) કોલર
C) તાંબુ	3) કુદ્રેમુખ
D) લોખંડ	4) જરિયા

A) A-2, B-4, C-1, D-3 B) A-1, B-2, C-3, D-4
C) A-4, B-3, C-2, D-1 D) A-3, B-4, C-1, D-2

115. નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે?
A) કલ્પક્કમ B) તારાપુર C) નરોરા D) કોટા

116. ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેચવામાં આવેલ છે?
A) છ B) સાત C) દસ D) આઠ

117. પશ્ચિમ બંગાળ અને એસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે?
A) વસંત ઋતુનો તોફાની વરસાદ B) આમ્રવૃષ્ટિ
C) બ્લોસમ શાવર્સ D) ચેરી શાવર્સ

118. તાજેતરમાં ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય કયાં આવેલ છે?
A) રાયપુર, છત્તીસગઢ B) જૂનાગઢ, ગુજરાત
C) રતલામ, મધ્યપ્રદેશ D) રાયબરેલી ઉત્તરપ્રદેશ

119. હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે?
A) નંદા દેવી B) માઉન્ટ એવરેસ્ટ
C) નંગા પર્વત D) કાંચનજંઘા

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

120. ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એક માત્ર રાજય :
A) આસામ B) જમ્મુ અને કાશ્મીર
C) હિમાચલ પ્રદેશ D) મેઘાલય

121. નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વાવેતર વિસ્તાર ધરાવે છે?
A) જવ અને મકાઈ B) જુવાર અને બાજરી
C) ચોખા D) ઘઉં

122. નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage System) બંગાળના અખાતમાં આવેલી છે?
A) ગંગા, બ્રહ્મપુત્રા અને ગોદાવરી
B) મહાનદી, ક્રિષ્ના અને કાવેરી
C) લૂણી, નર્મદા અને તાપ્તી
D) (A) અને (B) બંને

123. નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારના મેદાનો પૂરતી મર્યાદિત છે?
A) કાંપવાળી જમીન B) કાળી જમીનો
C) લેટરાઈટ જમીનો D) લાલ જમીનો

124. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે?
A) રીંછ B) હાથી C) વાઘ D) હરણ

125. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે કયો છે?
A) દિલ્હી - કાનપુર એક્સપ્રેસવે
B) આગ્રા-દિલ્હી એક્સપ્રેસવે
C) આગ્રા - લખનઉ એક્સપ્રેસવે
D) લખનઉ-વારાણસી એક્સપ્રેસવે

126. કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે?
A) પીસ્ટી જમીન B) શુષ્ક જમીન
C) જંગલ જમીન D) કાંપવાળી જમીન

127. ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે?
A) ઉષ્ણકટિબંધીય પાનખર
B) સવાના અને રણ વનસ્પતિ
C) વિષુવવૃત્તિય (લીલા) સદાબહાર
D) ઉષ્ણકટિબંધીય વરસાદી વન

128. ભારતમાં કાગળની પ્રથમ મીલ કયાં સ્થપાઈ?
A) સીરામપુર B) ચેન્નાઈ C) ટીટાનગર D) નાસિક

110)B, 111)A, 112)C, 113)D, 114)A, 115)B, 116)D, 117)A, 118)A, 119)B, 120)B, 121)C, 122)D, 123)A, 124)C, 125)C, 126)D, 127)A, 128)A.

GPSC Class - 2 - 18/12/2016

129. પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે?
A) કેરળ-તમિલનાડુ B) કેરળ-કર્ણાટક
C) કર્ણાટક - આંધ્રપ્રદેશ D) આંધ્રપ્રદેશ

130. સિંદરી શાના માટે પ્રખ્યાત છે?
A) તાંબાના વાસણ માટે B) રાસાયણિક ખાતર માટે
C) કાગળઉદ્યોગ માટે D) વિમાન ઉદ્યોગ માટે

131. મંડોવી અને જુઆરી નદીઓ ક્યા રાજયમાં આવેલી છે?
A) ગુજરાત B) ગોવા C) કર્ણાટક D) મહારાષ્ટ્ર

132. મુર્રા (Murrah) ક્યા પ્રાણીની પ્રજાતિ છે?
A) ગાય B) બકરી C) ભેંસ D) ઘેટું

133. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજય કયું છે?
A) ઉત્તરપ્રદેશ B) મધ્યપ્રદેશ C) મહારાષ્ટ્ર D) બિહાર

134. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયાં આવેલો છે?
A) ગ્રેટ નિકોબાર ટાપુ B) બેરન ટાપુ
C) મિડલ આંદામાન ટાપુ D) મિનિકોય ટાપુ

135. નેપાનગર શેના માટે પ્રખ્યાત છે?
A) છાપાના કાગળ B) રંગ-રસાયણ
C) ખાણઉદ્યોગ D) વીજળીના તાર

136. 'શક્તિમાન' ક્યા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે?
A) ઘઉં B) ડાંગર C) બાજરી D) મકાઈ

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

137. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે?
A) મહારાષ્ટ્ર B) અસમ C) બિહાર D) રાજસ્થાન

138. ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી .... આવેલું છે.
A) કર્કવૃત્તની ઉત્તરે B) વિષુવવૃત્તની દક્ષિણે
C) વિષુવવૃત્તની ઉત્તરે D) મકરવૃત્તની દક્ષિણે

139. યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે?
A) ગંગા B) સિંધુ C) બ્રહ્મપુત્રા D) મહાનંદી

140. નીચેના પૈકી ક્યો રેખાંશ ભારતીય માનક સમય (Indian Standard Time) નિયત કરે છે?
A) 85.5 E B) 86.5 E C) 84.5 E D) 82.5 E

141. ભારતે ઈરાન સાથે ક્યા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો?
A) ચાબહાર B) ગ્વાદર C) નોશાહર D) અંજલિ

142. ભૌગોલિક રીતે, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે?
A) ડક્કેન ઉચ્ચપ્રદેશ B) દરિયા કિનારાના મેદાનો
C) દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશ D) ઉત્તર ભારતીય મેદાનો

143. ભારતની સૂચિત ગેસ પાઈપલાઈન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય થશે?
A) તજાકિસ્તાન - અફઘાનિસ્તાન - પાકિસ્તાન - ભારત
B) તુર્કમેનિસ્તાન - અફઘાનિસ્તાન - પાકિસ્તાન - ભારત
C) તુર્કિ - અફઘાનિસ્તાન - પાકિસ્તાન - ભારત
D) તારાકેટ - અસતના - પેશાવર - ઈંદોર

GPSC Class - 2 - 12/2/2017

144. 2011 ના સેન્સસ મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માં 60 વર્ષથી વધુ વય જૂથના લોકો ની વસ્તીની ટકાવારી જણાવો.
A) 8.5 અને 9.2 B) 8.6 અને 7.9
C) 8.1 અને 8.8 D) 8.2 અને 9.0

145. દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા કયાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે?
A) EXIM Bank B) IWRFC
C) SIDBI D) SMERA

GPSC Class - 2 - 28/1/2017

146. દેશના રાજયોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ (Union Territory) માં સૌથી વધારે વસ્તીની ગીચતા (Density of Population - Population per Sq. km.) કયા છે.?
A) બિહાર અને ચંદીગઢ B) ઉત્તરપ્રદેશ અને દિલ્હી
C) બિહાર અને દિલ્હી D) ઉત્તરપ્રદેશ અને ચંદીગઢ

147. તળાવો અને રાજયોને યોગ્ય રીતે ગોઠવો.

1) સાંભાર લેક (Sambhar Lake)	A) ઓરીસ્સા (Orissa)
2) લોનાર લેક (Lonar Lake)	B) મહારાષ્ટ્ર (Maharastra)
3) ચીલકા લેક (Chilka Lake)	C) રાજસ્થાન (Rajasthan)
4) પુલીકટ લેક (Pulicut Lake)	D) તામીલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ (Tamilnadu And Andhrapradesh)

A) 1-B, 2-C, 3-D, 4-A B) 1-A, 2-B, 3-C, 4-D
C) 1-D, 2-A, 3-B, 4-C D) 1-C, 2-B, 3-A, 4-D

129)A, 130)B, 131)B, 132)C, 133)D, 134)B, 135)A, 136)D, 137)B, 138)C, 139)C, 140)D, 141)A, 142)A, 143)B, 144)C, 145)B, 146)C, 147)D.

148. રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો.

1) સેન્ટ્રલ (Central)	A) ચેન્નાઈ
2) ઈસ્ટર્ન (Eastern)	B) મુંબઈ
3) નોર્થન (Northern)	C) કલકત્તા
4) સધર્ન (Southern)	D) નવી દિલ્હી

A) 1-D, 2-A, 3-B, 4-C B) 1-C, 2-D, 3-A, 4-B
C) 1-B, 2-C, 3-D, 4-A D) 1-A, 2-B, 3-C, 4-D

149. વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.

1) Coffee Board	A) કોટ્ટાયમ (Kottayam)
2) Rubber Board	B) કલકત્તા (Kolkatta)
3) Tea Board	C) કોચી (kochi)
4) Spice Board	D) બેંગાલુરૂ (Bangaluru)

A) 1-D, 2-A, 3-B, 4-C B) 1-D, 2-B, 3-C, 4-A
C) 1-B, 2-C, 3-A, 4-D D) 1-C, 2-A, 3-D, 4-B

GPSC Class-1 - 15/01/2017

150. ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને ક્યા નામથી ઓળખવામાં આવે છે?
A) બોર્ડર સીક્યોરીટી ફોર્સ B) નેશનલ સીક્યોરીટી ગાર્ડ
C) સુરક્ષા સીમા બળ D) રેપીડ એક્શન ફોર્સ

151. તલ દક્ષિણ ભારતમાં ક્યા પાક તરીકે ઊગાડવામાં આવે છે?
A) ખરીફ પાક B) રવિ પાક
C) જાયદ જમીન D) ખરીફ પાક અને રવિ પાક

152. ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે?
A) 4 B) 5 C) 6 D) 7

153. ભારતમાં ક્યા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો?
A) 1901 થી 1911 B) 1911 થી 1921
C) 1951 થી 1961 D) 2001 થી 2011

154. ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે તાજેતરમાં કોની વચ્ચે કરાર થયા?
A) ધી વર્લ્ડ બેન્ક અને ભારત સરકાર
B) ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર
C) ધી એશિયન ડેવલોપમેન્ટ બેંક અને ભારત સરકાર
D) ધી એશિયન ડેવલોપમેન્ટ બેંક અને ઉત્તરપ્રદેશ સરકાર

155. નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ - વે કયો છે?
A) આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે
B) મુંબઈ - પૂના એક્સપ્રેસ વે
C) હૈદરાબાદ ઓ. આર.આર.
D) યમુના એક્સપ્રેસ વે

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

156. હિમાલય ક્યા પ્રકારના ભુ-ગર્ભિક પર્વત છે ?
A) ગેડ પર્વતો B) ખંડ પર્વતો
C) ઘુમ્મટાકાર પર્વતો D) જ્વાળામુખી પર્વતો

157. મહા નદીના જળનો વિવાદ ક્યા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે?
A) છત્તીસગઢ અને ઝારખંડ B) ઓડિસ્સા અને છત્તીસગઢ
C) ઓડીસ્સા અને ઝારખંડ D) ઝારખંડ અને બિહાર

158. હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ?
A) ભારતીય જંગલો B) નિત્ય લીલા જંગલો
C) શંકુદ્રુમ જંગલો D) ખરાઉ જંગલો

159. ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે ક્યા નામે ઓળખાય છે ?
A) હુગલી B) ગંડક C) કેન D) મેઘના

160. ભારતમાં "ઘઉંનો કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ?
A) હરિયાણા B) ગુજરાત C) પંજાબ D) મધ્યપ્રદેશ

161. ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે?
A) કર્ણાટકનો કુર્ગ B) પશ્ચિમ બંગાળના દાર્જલિંગ
C) જમ્મુ અને કાશ્મીરનાં બારામુલ્લાં
D) મહારાષ્ટ્રનાં કોંકણ

GPSC Class - 2 - 16/04/2017

162. કુદરતી સરોવરો અને સંબંધીત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકુ સાચુ નથી?
1) જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર
2) આંધ્રપ્રદેશ - કોલાર
3) તામિલનાડું - ચિલ્કા
4) રાજસ્થાન - સાંભર
A) 1 B) 3 C) 4 D) 2

163. સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributory) કઈ છે?
A) જલેમ B) સતલજ C) રાવી D) ચિનાબ

164. ઐતહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયુ જોડકુ યોગ્ય નથી?
1) બારડોલી - સરદાર સ્મારક
2) સુરત - ચિંતામણી જૈન દેરાસર
3) ઉદવાડા - આતશે બહેરામ
4) આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
A) 4 B) 3 C) 2 D) 1

148)C, 149)A, 150)C, 151)B, 152)C, 153)B, 154)C,155)A, 156)A, 157)B, 158)C, 159)D, 160)C, 161)A, 162)B, 163)D, 164)A.

165. સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે?
A)ચંદ્રના આકર્ષણના કારણે
B)સમુદ્રનાં પ્રવાહોને કારણે
C)જમીનનાં દબાણને કારણે
D)જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણો

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

166. ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ?
A)3 B)4 C)5 D)2

167. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે ?
A)3210 B)3216 C)3214 D)2933

168. આંધ્ર પ્રદેશમાંથી તેલગંણા રાજ્ય ક્યા વર્ષમાં અલગ થયું ?
A)2015 B)2014 C)2013 D)2012

169. ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે ?
A)મધ્યપ્રદેશ B)રાજસ્થાન C)મહારાષ્ટ્ર D)આંધ્રપ્રદેશ

170. બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ ક્યાં રાજ્યમાં આવેલા છે ?
A)જમ્મુ-કાશ્મીર B)હિમાચલ પ્રદેશ
C)ઉત્તરાખંડ D)સિક્કીમ

171. યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી?
A)ચંબલ B)પિંડાર C)બેતવા D)કેન

172. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં .... ની બૌની જાતિના ઉપયોગથી થઈ.
A)ડાંગર B)ઘઉં C)કઠોળ D)તેલિબિયાં

173. ભારતમાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?
A)ઉત્તરપ્રદેશ B)રાજસ્થાન C)હરિયાણા D)પંજાબ

174. ભારતમાં કુલ કેટલા પરમાણું ઉર્જા કેન્દ્રો છે ?
A)4 B)5 C)7 D)8

175. ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય ક્યું છે ?
A)ગુજરાત B)મહારાષ્ટ્ર
C)પશ્ચિમ બંગાલ D)ઉત્તરપ્રદેશ

176. કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ?
A)2 B)4 C)3 D)5

177. વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું ?
A)પ્રશ્ચિમબંગાળ B)મધ્યપ્રદેશ
C)હિમાચલ પ્રદેશ D)કર્ણાટક

GPSC આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) - 26/03/2017

178. અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધીત દેશોના જોડકામાંથી ક્યું જોડકુ સાચું નથી?
1) મેક મોહન લાઈન - ભારત અને ચીન Mac Mohan Line
2) ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત Durand Line
3) મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની Maginot Line
A)માત્ર - 1 B)માત્ર - 2 C)માત્ર - 3 D)1, 2, અને 3

179. દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન (Irrigated land) અંદાજે કેટલા ટકા છે?
A)44 B)64 C)35 D)26

180. નદી અને તેનાં ઉપરનાં પ્રોજેકટને યોગ્ય રીતે ગોઠવો.
A)ક્રિષ્ણા 1. હિરાકુંડ
B)તાપી 2. કાકરાપાર
C)મહાનદી 3. નાગાર્જુન
D)ચીનાબ 4. સલાલ પ્રોજેકટ
A)1-C, 2-A, 3-B, 4-D B)1-B, 2-C, 3-D, 4-A
C)1-A, 2-B, 3-C, 4-D D)1-C, 2-B, 3-A, 4-D

181. વન્યજીવન-અભ્યારણ્યનું નામ અને તેના સ્થળનાં જોડકાઓમાંથી કયા જોડકા સાચા છે?

નામ	રાજ્ય
A)ચસમ પાની અભ્યારણ્ય	- આસામ
B)નમદાફા અભ્યારણ્ય	- અરુણાચલ પ્રદેશ
D)ઘુડખર અભ્યારણ્ય	- ગુજરાત
C)કુંભતી અભ્યારણ્ય	- રાજસ્થાન

A)1 અને 2 B)2 અને 3 C)2, 3, અને 4 D)1, 2, અને 3

182. ખનિજ અને તેના ઉત્પાદિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) સિંધા લૂણ (Rock Salt) A)છત્તીસગઢ
2) હીરા (Diamond) B)મધ્યપ્રદેશ
3) નીકલ (Nickel) C)હિમાચલ પ્રદેશ
4) કલાઈ (Tin) D)ઓરીસ્સા
A)1-B, 2-D, 3-A, 4-C B)1-C, 2-B, 3-D, 4-A
C)1-D, 2-A, 3-C, 4-B D)1-A, 2-C, 3-B, 4-D

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

183. ઉત્તર થી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.
A)નર્મદા, તાપી, ક્રિશ્ના, ગોદાવરી, કાવેરી
B)તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિશ્ના, કાવેરી
C)નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિશ્ના, કાવેરી
D)તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિશ્ના, કાવેરી

165)A, 166)B, 167)C, 168)B, 169)B, 170)A, 171)B, 172)B, 173)D, 174)C, 175)B, 176)C, 177)B, 178)B, 179)C, 180)D, 181)D, 182)B, 183)C.

184. નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે?
A)જલદાપરા B)હજારીબાગ C)સારિસ્કા D)કોર્બેટ

185. નીચેના પૈકી કયા ભારતીય શહેરને "પૂર્વનું વેનિસ" કહેવાય છે.
A)ગુંટુર B)ગોવા C)હૈદ્રાબાદ D)ઉદયપુર

186. ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં કયાં સ્થાપવામાં આવ્યું હતું?
A)મુંબઈ B)કાનપુર C)જમશેદપુર D)ચેન્નાઈ

187. ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયાં રાજયમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે?
A)કેરળ B)મિઝોરમ C)ત્રિપુરા D)ગોવા

188. ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે?
A)દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ
B)દાદરા અને નગર હવેલી
C)આંદામાન અને નિકોબાર D)પુંડુચેરી (પોંડીચેરી)

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

189. નીચેના પૈકી કયા રાજયમાંથી કર્કવૃત પસાર થતો નથી?
A)મિઝોરમ B)ત્રિપુરા C)છત્તીસગઢ D)મણિપુર

190. પ્ટ્રોલીયમ કયાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે?
A)અગ્નિકૃત ખડકો B)પ્રસ્તર ખડકો
C)વિકૃત ખડકો D)ભેજવાળી જમીન

191. અલકનંદા અને ભગીરથીનો સંગમ કયાં થાય છે?
A)દેવપ્રયાગ B)કરણપ્રયાગ C)રૂદ્રપ્રયાગ D)વિષ્ણુપ્રયાગ

192. પૃથ્વીની પરિભ્રમણની ગતિને.......... ગતિ પણ કહે છે.
A)માસિક B)દૈનિક C)વાર્ષિક D)અઠવાડીક

193. કયાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે.
A)નીલગીરી B)બાવળ C)ચીડ D)સીસમ

194. નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે?
A)નર્મદાસાગર યોજના B)સરદાર સરોવર યોજના
C)વેનગંગા યોજના D)રામસાગર યોજના

195. વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી કયાં રાજયમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે?
A)નાગાલેન્ડ B)કેરળ C)ગુજરાત D)મહારાષ્ટ્ર

196. બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી.નું અંતર હોય છે?
A)139 કિ.મી. B)122 કિ.મી.
C)111 કિ.મી. D)211 કિ.મી.

GPSC Class - 2 - 18/03/2017

197. પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો) માં વિભાગમાં આવે છે.
A)બે B)ત્રણ C)ચાર D)પાંચ

198. અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે?
A)ગોદાવરી B)કાવેરી C)ક્રિષ્ણા D)મહાનદી

GPSC Class - 1 - 28/01/2017

199. ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે?
A)1 B)6 C)4 D)5

200. ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે?
A)આંદામાન-નિકોબાર દ્વિપસમૂહ B)મિઝોરમ
C)મણિપુર D)ત્રિપુરા

201. ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કયાં ક્રમે આવે છે?
A)3 B)2 C)1 D)4

202. ભાકરા - નાંગલ બહુહેતુક યોજનાના કયા રાજયો લાભાન્વિત રાજયો છે?
A)પંજાબ B)જમ્મુ કાશ્મીર
C)હરિયાણા D)પંજાબ, હરિયાણા, રાજસ્થાન

203. નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.
A)નીલગિરીનું સૌથી ઊંચુ શિખર - દોદાબેટા
B)પશ્ચિમઘાટનું સૌથી ઊંચુ શિખર - કળસુબાઈ
C)કારાકોરમનું સૌથી ઊંચુ શિખર - કામેત
D)આબુનું સૌથી ઊંચુ શિખર - ગુરુશિખર

204. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ કયાં આવેલ છે?
A)હૈદ્રાબાદ B)મુંબઈ C)દિલ્હી D)મૈસૂર

205. ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજયની છે?
A)બિહાર B)મધ્યપ્રદેશ C)ઝારખંડ D)ઉત્તરાંચલ

206. ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો.કિ.મી.)નીચે દર્શાવેલ રાજય પૈકી કયા રાજયમાં સૌથી વધારે છે?
A)મહારાષ્ટ્ર B)બિહાર
C)પશ્ચિમ બંગાળ D)કલકત્તા

207. ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું?
A)ઓઝોન B)મીક
C)સલ્ફર ડાયોકસાઈડ D)મિથેન

નાયબ ચિટનીશ - 02/06/2015

208. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ.......... છે.
A)પાંચમો B)સાતમો C)છઠ્ઠો D)આઠમો

209. ભારતનો પ્રમાણ સમય એટલે.......
A)82.5^0 પશ્ચિમ રેખાંશ B)83.5^0 પશ્ચિમ રેખાંશ
C)83.5^0 પૂર્વ રેખાંશ D)82.5^0 પૂર્વ રેખાંશ

184)A, 185)D, 186)D, 187)A, 188)C, 189)D, 190)B, 191)A, 192)B, 193)C, 194)A, 195)A, 196)C, 197)B, 198)C, 199)B, 200)A, 201)B, 202)D, 203)C, 204)D, 205)A, 206)B, 207)B, 208)B, 209)D.

નાયબ ચિટનીશ - 05/02/2017

210. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?
A)ખંડ પર્વત B)જ્વાળામુખી પર્વત
C)અવશિષ્ટ પર્વત D)ગેડ પર્વત

211. શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ?
A)વિષુવવૃત્ત B)કર્કવૃત્ત C)ધ્રુવવૃત્ત D)મકરવૃત્ત

GPSC Class - 2 - 16/04/2017

212. કોયલી, મથુરા અને હલ્દીયા રિફાઈનરીની સ્થાપના કોણે કરી છે?
A)હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો.લિ.
B)ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
C)ઈન્ડિયન ઓઈલ કોર્પો. લિ.
D)બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.

213. ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) પહેલગામ B) જમ્મુ કાશ્મીર
2) મુન્નાર D)કેરળ
3) શીલોંગ B) મેઘાલય
4) કોડાઈકેનાલ D)તમિલનાડુ
A)1-A, 2-B, 3-C, 4-D B) 1-B, 2-C, 3-D, 4-A
C)1-C, 2-D, 3-A, 4-B D)1-D, 2-A, 3-B, 4-C

214. નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી?
A)રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન
B)જીમ કોર્બેટ નેશનલ પાર્ક - ઉત્તરાખંડ
C)બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ
D)કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ

215. શબરી માલ : ધાર્મિક સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?
A)કેરળ B)કર્ણાટક C)આંધ્રપ્રદેશ D)તેલંગાણા

216. માન.વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્દઘાટન કરેલ છે. આ ટનલ ક્યા રાજ્યમાં આવેલી છે?
A)પંજાબ B) જમ્મુ અને કાશ્મીર
C)મધ્યપ્રદેશ D)મહારાષ્ટ્ર

GPSC Class - 2 - 02/04/2017

217. ભારતનું સૌથી મોટું બંદર કયું છે ?
A)વિશાખાપટ્ટનમ B)તુતીકોરીન
C)કોલકાતા D)મુંબઈ

218. ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ?
A)30 % B)20 % C)25 % D)32 %

219. અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ?
A)ટીંબા B)રોહી C)ધ્રીયા D)દુઆર

220. સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી ક્યા પાકની ખેતી કરવામાં આવતી નથી ?
A)ચોખા B)શણ C)ઘઉં D)શેરડી

221. ....નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે.
A)ગોદાવરી B)કૃષ્ણા C)કાવેરી D)બનાસ

222. લક્ષદ્વિપ અને મિનિકોય ટાપુઓમાં કુલ......ટાપુઓ છે અને પૈકી .... ટાપુઓમાં માનવ વસતી છે.
A)32, 10 B)36, 09 C)36, 11 D)32, 11

223. હુગલી ઔદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી ક્યું છે ?
A)કોલકાતા-હાવડા B)કોલકાતા-મેદનીપુર
C)કોલકાતા-રિશરા D)કોલકાતા- કોન નગર

224. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં ખ્રીસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?
A)નાગાલેન્ડ B)મિઝોરમ C)મેઘાલય D)મણિપુર

225. 'Gods own country'એ ક્યા રાજ્યને સંબંધિત છે ?
A)ઉત્તરાખંડ B)કર્ણાટક
C)કેરાલા D)હિમાચલ પ્રદેશ

226. મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર ક્યું હતું?
A)કોલકાતા B)મુંબઈ C)દિલ્હી D)બેંગ્લોર

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

227. ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?
A)ચૂખા જળવિદ્યુત યોજના B)સિખો જળવિદ્યુત યોજના
C)મૈત્રી જળવિદ્યુત યોજના D)ઉપરના પૈકી કોઈ નહીં

228. ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં ક્યા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ?
A)નેલોર B)શ્રી હરિકોટા C)કોવાડા D)બેંગ્લુરૂ

229. ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો ક્યા નામે ઓળખયા છે ?
A)કોરોમંડલ B)સિરકાર
C)થાલ ઘાટ D)ઉપરના પૈકી કોઈ નહીં

230. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, ક્યા રાજ્યમાં આવેલું છે ?
A)કેરળ B)રાજસ્થાન C)તમિલનાડુ D)મણિપુર

231. "ઈન્દિરા ગાંધી નહેર" નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે?
A)યમુના B)ચંબલ C)સિંધુ D)સતલજ

210)D, 211)A, 212)C, 213)A, 214)C, 215)A, 216)B, 217)D, 218)C, 219)B, 220)C, 221)D, 222)C, 223)A, 224)A, 225)C, 226)A, 227)A, 228)C, 229)A, 230)D, 231)D.

232. નીચેના પૈકી ક્યુ કૃત્રિમ બારું (Harbour) નથી ?
A) કંડલા B) કોચીન C) બેંગ્લુરૂ D) મેંગ્લોર

233. ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે ?
A) રૂદ્રપ્રયોગ B) બંદ્રીનાથ C) ગૌમુખ D) કેદારનાથ

GPSC Class - 2 - 12/02/2017

234. તામિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે ક્યા ઉદ્યોગને સંબંધિત છે?
A) સિમેન્ટ ઉદ્યોગ B) રસાયણ ઉદ્યોગ
C) ખાતર ઉદ્યોગ D) એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ

235. ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ ક્યા રાજયમાં શરૂ કરવામાં આવેલ છે?
A) ગુજરાત B) તામિલનાડુ C) મહારાષ્ટ્ર D) કેરળ

236. ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે?
A) કાવેરી B) કૃષ્ણા C) નર્મદા D) પાતી

237. લૂસાઈ ટેકરીઓ ક્યા રાજયમાં આવેલી છે?
A) મિઝોરમ B) નાગાલેન્ડ C) મણિપુર D) મેઘાલય

238. ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે?
A) ત્રણ B) ચાર C) છ D) બે

GPSC Class - 1 - 09/04/2017

239. ભારતમાં નીચે દર્શાવેલ ભાષા-સમૂહમાંથી કયો ભાષા-સમૂહ સૌથી વધુ છે ?
A) ચીની - તિબ્બતી (કિરાત) B) આસ્ટ્રિક (નિષાદ)
C) ભારતીય - યુરોપીય (આર્ય) D) દ્રવિડ

240. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે ?
A) 2 B) 3 C) 4 D) 6

241. કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ?
A) 5 B) 7 C) 6 D) 8

242. ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી ક્યા ખનીજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ?
A) અબરખ B) લીખંડ C) બોક્સાઈટ D) તાંબુ

243. સિંધુ નદી ભારતના ક્યા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે?
A) દમચૌક B) મીરપુર C) ચિલ્લડ D) મુઝફ્ફરાબાદ

244. ધી ઈન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું ?
A) હીરાપુર B) મીરપુર C) કુલ્ટી D) કોલકત્તા

245. 15 ઓગસ્ટ, 1950ના દિવસે રીક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં ક્યા સ્થાને આવેલ હતો ?
A) અરૂણાચલ પ્રદેશ B) આંદામાન દ્વીપસમૂહ
C) કચ્છ D) શિલોંગ

246. નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉધ્યાનો, અભ્યારણ્યો પૈકી ક્યા રાષ્ટ્રીય ઉદ્યાન / અભ્યારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે ?
A) કાન્હા B) કાઝીરંગા C) ગીર D) કોર્બેટ

247. તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી ક્યા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ?
A) સૌર ઉર્જા B) ભૂ-તાપીય ઉર્જા
C) પવન ઉર્જા D) જૈવ ઉર્જા

248. વિક્ટોરીયા જ્યુબિલી મ્યુઝીયમ નીચે પૈકી ક્યા સ્થળે આવેલ છે?
A) કોલકત્તા B) વિજયવાડા C) ન્યૂ દિલ્હી D) મુંબઈ

GPSC Class - 2 - 04/03/2017

249. નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ?
A) ઉડતી ખિસકોલી B) સફેદ હાથી
C) સફેદ વાઘ D) યાયાવર પક્ષીઓ

250. બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચુ શિખર ક્યું છે ?
A) મુલ્લયનગિરિ B) નિલાયનગિરિ
C) ડોડાબેટ્ટામગિરિ D) મુકુર્તિગિરિ

251. નીચે પૈકી ક્યા રાજયમાં કાળી જમીન જોવા મળતી નથી ?
A) આંધ્રપ્રદેશ B) તેલંગાણા C) ગુજરાત D) ઓડિશા

252. દ્વીપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી ક્યો છે?
A) નહેરો B) તળાવો
C) કૂવા અને ટ્યુબવેલ D) ઉપરોક્ત બધા જ

253. માલઝખંડ શાના માટે જાણીતું છે ?
A) ચાંદીની ખાણો B) સોનાની ખાણો
C) તાંબાની ખાણો D) હીરાની ખાણો

254. ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વિપ આવેલો છે?
A) ગંગા B) યમુના C) કોસી D) બ્રહ્મપુત્રા

255. "ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ?
A) યમુના B) બિયાસ C) ચંબલ D) સતલજ

256. ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલ મોટું બંદર (Corporatised Major Port) ક્યું છે ?
A) કંડલા B) મુંબઈ
C) કમરાજાર D) નાહ્વાશેવા (JNPT)

232)C, 233)C, 234)C, 235)B, 236)A, 237)A, 238)B, 239)C, 240)C, 241)B, 242)C, 243)C, 244)A, 245)A, 246)B, 247)C, 248)B, 249)A, 250)A, 251)D, 252)B, 253)C, 254)D, 255)C, 256)C.

GPSC Class - 2 - 18/03/2017

257. નીચેનામાંથી ક્યા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે ?
A) ત્રિપુરા B) મિઝોરમ
C) મેઘાલય D) અરૂણાચલ પ્રદેશ

258. "ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ?
A) પેટ્રોલિયમ B) ખાતર
C) ચામડા નિર્મિત વસ્તુઓ D) ઈંડા

259. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ?
A) ગુજરાત B) મહારાષ્ટ્ર C) તમિલનાડુ D) ગોવા

260. "એટમ બોમ્બ" ક્યા ફળ / પાકની સંકર જાતિ છે ?
A) નારંગી B) મકાઈ C) ચીકુ D) જામફળ

261. નીચે પૈકી ક્યા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે?
A) રાજસ્થાન B) ઝારખંડ
C) મધ્યપ્રદેશ D) ઉપરોક્ત એકપણ નહીં

262. કઈ સીમારેખા "રેડક્લિફ રેખા" કહેવાય છે ?
A) ભારત તથા અફઘાનિસ્તાન B) ભારત અને ચીન
C) ભારત તથા બાંગ્લાદેશ D) ભારત અને પાકિસ્તાન

263. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?
A) ગુજરાત B) ગોવા C) મહારાષ્ટ્ર D) કર્ણાટક

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

264. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ?
A) લગૂન B) લંબગોળ
C) ગોળ D) ઘોડાની નાળ જેવા

265. સૂર્યના પ્રથમ કિરણો ભારતના ક્યા રાજ્યમાં પડે છે ?
A) નાગાલેન્ડ B) સિક્કિમ
C) મેઘાલય D) અરૂણાચલ પ્રદેશ

266. ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું ક્યું ખનીજ મળે છે?
A) કાચું લોખંડ B) મેંગેનીઝ C) બોક્સાઈટ D) અબરખ

267. બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
A) લોહિત B) કેનુલા C) દિહાંગ D) ત્સાંગપો

268. દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ?
A) પહેલી B) બીજી C) ચોથી D) ત્રીજી

269. ભારતનું ક્યું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ?
A) કેરાલા B) સિક્કિમ C) મણિપુર D) મધ્યપ્રદેશ

270. ઉડતી ખિસકોલીઓ ક્યા જોવા મળે છે ?
A) કચ્છના મોટા રણમાં
B) હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં
C) દલદલના વિસ્તારોમાં
D) પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં

271. પક્ષી અભયારણ્યના સંદર્ભમાં ક્યું સાચું નથી ?
A) રંગનાથિટ્ટુ B) નળ સરોવર
C) રાજગીર D) વેદાનથાંગલ

272. નીચે દર્શાવેલ ફળો પૈકી ક્યું ફળ ઝાડ પર તોડ્યા બાદ પાકતુ નથી?
A) સક્કરજન B) ચેરી C) પપૈયાં D) જમરૂખ

GPSC Class - 2 - 5/3/2017

273. ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.

1) ઈન્દીરા ગાંધી ઈન્ટર નેશનલ એયર પોર્ટ	A) અમદાવાદ
2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ	B) બેંગલુરૂ
3) કેમ્પીગોવડા (Kempegowda) ઈન્ટરનેશનલ એયર પોર્ટ	C) મુંબઈ
4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ	D) દિલ્હી

A) 1-C, 2-B, 3-A, 4-D B) 1-D, 2-C, 3-B, 4-A
C) 1-B, 2-A, 3-D, 4-C D) 1-D, 2-B, 3-C, 4-A

GPSC Class - 2 - 11/12/2016

274. નીચેના પૈકી ક્યા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી ?
A) ભાગીરથી B) અલકનંદા C) જહાનવી D) ગૌતમી

275. લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ ક્યા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?
A) જવાહરલાલ નેહરૂ પોર્ટ B) એનરોર પોર્ટ
C) કંડલા પોર્ટ D) કોચી પોર્ટ

GPSC Class - 2 - 05/02/2017

276. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?
A) ગોદાવરી B) કૃષ્ણા C) કોસી D) કાવેરી

257)C, 258)B, 259)D, 260)D, 261)B, 262)D, 263)B, 264)D, 265)D, 266)A, 267)C, 268)D, 269)B, 270)D, 271)C, 272)B, 273)B, 274)D, 275)A, 276)C.

277. બંને ગોળાર્ધમાં 30^0 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મીની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ....તરીકે ઓળખાય છે.

A)નોર્વેસ્ટર B)જેટ સ્ટ્રીમ

C)આઈ.ટી.સી. ઝોન D)ઉપર પૈકી એક પણ નહી

278. ભારતમાં નિચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે?

A)યમુના B)ગંગા C)ગોદાવરી D)નર્મદા

279. મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી?

A)ઉષ્ણતાપમાન B)બાષ્પીભવન

C)તાજા પાણીનો જથ્થો

D)દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

280. "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજયમાં અનુસરવામાં આવે છે?

A)સિક્કીમ B)મેઘાલય

C)હિમાચલ પ્રદેશ D)અરૂણાચલ પ્રદેશ

281. ગુરગાંવ કયાં આવેલું છે?

A)દિલ્હી B)ન્યુ દિલ્હી C)હરિયાણા D)પંજાબ

282. રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે?

A)ભદ્રા B)બ્રાહ્મણી C)દામોદર D)ભીમા

283. પશ્ચિમઘાટના વર્ષાછાયામા નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે?

A)મહાબળેશ્વર B)બારામતી

C)પંચગીની D)રત્નાગીરી

284. વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે?

A)વસ્તીવૃદ્ધિ B)વસ્તીનું વિતરણ

C)વસ્તીની ગીચતા D)વસ્તીનું સ્થળાંતર

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

285. ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System) વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે?

A)પશ્ચિમ ઘાટ B)અરવલ્લી C)વિધ્યાંચલ D) સાતપુડા

286. કયા પાકની ખેતીને 'કોદાળી ખેતી' (Hoe Culture) કહેવાય?

A)મકાઈ B)જુવાર C) શણ D) ચોખા

287. વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે?

A)80.84% B) 82.14% C) 81.16% D)84.86

288. કઈ નદી પર પોંગ બંધનું નિર્માણ થયું છે?

A)બિયાસ B)રાવી C) સતલુજ D) ચિનાબ

289. ઉત્તરભારતના એક રાજયમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે?

A)અખરોટ B)જરદાલુ

C)કેસર D)એકપણ નહીં

290. 'બોમ્બે હાઈ' એ ખનિજતેલનું ઉત્પાદન કયારે શરૂ કર્યું?

A)ઈ.સ.1970 B)ઈ.સ.1971

C)ઈ.સ.1972 D)ઈ.સ.1973

291. નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી?

A)પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ

B)બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ

C)જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ

D)શાહજહાંપુર - રેશમી કાપડ ઉદ્યોગ

292. ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે?

A)ગંગા B)મહાનદી C)સુવર્ણરેખા D)ઋષિકુલ્ય

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

293. હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ?

A) હિમાચલ પ્રદેશ B) જમ્મુ અને કાશ્મીર

C) ઉત્તરાખંડ D) સિક્કિમ

294. કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ?

A) કાંપવાળી B) કાળી માટી

C) એક પ્રકારની લાલ માટી D) રાતી માટી

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

295. ભારતના દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે ?

A)જમણી બાજુથી B)ઉપરથી

C)મધ્યમાંથી D)ડાબી બાજુથી

296. ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે ?

A)22 માર્ચે B)22 ડિસેમ્બરે C)22 જૂને D)22 નવેમ્બરે

297. ભારતના ક્યા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ?

A)રાજસ્થાન B)ગુજરાત C)મહારાષ્ટ્ર D)કેરળ

298. વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ?

A)નેપાનગર B)ઈન્દોર C)દેવાસ D)ભોપાલ

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

299. નીચેનામાંથી ક્યો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ?

A)અમૃતસર B)જયપુર C)ઉદયપુર D)પંજાબ

300. ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ?

A)મરાઠી B)હિન્દી C)ગુજરાતી D)કોંકણી

277)B, 278)B, 279)D, 280)B, 281)C, 282)B, 283)B, 284)D, 285)C, 286)D, 287)B, 288)A, 289)C, 290)D, 291)D, 292)D, 293)C, 294)A, 295)C, 296)B, 297)D, 298)A, 299)D, 300)D.

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

301. ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.
A)23.5 ઉ.અ. B)82.5 પૂ.રે. C)68.0 પૂ.રે. D)એકેય નહીં

302. નીચેના પૈકી ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?
A)ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
B)ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
C)મધ્ય વિસ્તાર
D)દરિયા કિનારાનો તટ વિસ્તાર

303. ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે?
A)100 મિલીયન હેક્ટર B)148 મિલીયન હેક્ટર
C)162 મિલીયન હેક્ટર D)200 મિલીયન હેક્ટર

304. સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?
A)1 હેક્ટરથી ઓછી B)1 થી 2 હેક્ટર
C)2 થી 3 હેક્ટર D)3 હેક્ટરથી વધુ

305. મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ?
A)તુવેર - ઘઉં B)બાજરી - ઘઉં
C)સોયાબીન - ઘઉં D)આ બધા જ

306. ભારતમાં સરેરાશ પાકઘનિષ્ટતા (ક્રોપિંગ ઈન્ટેન્સીટી) કેટલી છે?
A)100 ટકા B)90 ટકા C)127 ટકા D)180 ટકા

307. જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?
A)કન્ટુર બંડિંગ B)ગ્રેડેડ બંડિંગ
C)બેન્ચ ટેરેસિંગ D)આમાંથી કોઈ નહીં

308. ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A)નવસારી B)આણંદ C)જબલપુર D)ઝાંસી

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

309. સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે?
A)તમિલનાડું B)મધ્યપ્રદેશ
C)ઓરિસ્સા D)હિમાચલ પ્રદેશ

310. મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે?
A)ગોદાવરી B)કિષ્ના C)કાવેરી D)પેન્નેરૂ

311. તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે?
A)આંધ્રપ્રદેશ B)કેરળ C)તમિલનાડું D)કર્ણાટક

312. વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે?
A)ભીંડા B)ટમેટા C)ચોખા D)કેળા

313. 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે?
A)મણિપુર B)મેઘાલય C)નાગાલેન્ડ D)આસામ

314. દક્ષિણ ભારતના એક રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક "કયાલ" છે, તે રાજ્ય કયું?
A)કેરળ B)કર્ણાટક
C)તમિલનાડું D)ઉપર પૈકી એકપણ નહીં

315. ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે?
A)છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ B)દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
C)લદાખનો ઉચ્ચપ્રદેશ D)કારાકોરમનો ઉચ્ચપ્રદેશ

316. બદામ પહાડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે?
A)બોક્સાઈડ B)લોહ-અયસ્ક C)ફ્લોરસ્પાર D)જસત

317. પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે?
A)કાવેરી B)પાયકારા C)તામ્રપર્ણી D)પેરિયાર

318. રાષ્ટ્રીય જળમાર્ગો ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે?
A)સાદિયાથી ધુબરી
B)ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપૂરમ્ નહેર
C)હકદીયાથી અલાહાબાદ
D)કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર

319. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે?
A)મિઝોરમ B)તામિલનાડુ C)કેરાલા D)મહારાષ્ટ્ર

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

320. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિ નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં ક્યા નામે ઓળખાય છે?
A)નીલગિરી B)મલબાર C)સાતપુડા D)ભાબર

321. બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં ક્યા નામે ઓળખાય છે?
A)જમુના B)માઝુલી C)અંબાલી D)ત્સાંગપો

322. કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ?
A)કૃષ્ણા B)નર્મદા C)ગંગા D)સતલુજ

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

323. મધ્ય પ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ?
A)બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર
B)તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ
C)ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, તેલંગણા
D)રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ

324. ભાકરાનાંગલ ડેમ, હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે?
A)ચમ્બા B)શિમલા C)બિલાસપુર D)કાંગરા

301)B, 302)A, 303)B, 304)A, 305)D, 306)C, 307)A, 308)D, 309)C, 310)B, 311)C, 312)A, 313)D, 314)A, 315)C, 316)B, 317)C, 318)B, 319)A, 320)A, 321)A, 322)C, 323)D, 324)C.

HTAT - 2015

325. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ક્યું છે ?
   - વુલર સરોવર (જમ્મુ-કાશ્મીર)

કલાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

326. ભારતમાં દર વર્ષે ચોમાસું ક્યા રાજ્યમાં પ્રથમ શરૂ થાય છે ?
   - કેરળ
327. પાણીની અછતનું મુખ્ય કારણ ક્યું છે ? - ભૂગર્ભજળમાં ઘટાડો
328. "ECO SENSITIVE ZONE" શેનીસાથે સંકળાયેલ છે ?
   - વન્યપ્રાણી અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન

પોલીસ કોન્સ્ટેબલ - 2012

329. ગંગા નદી ક્યા સમુદ્રને મળે છે? - બંગાળના ઉપસાગર
330. કઈ નદી આસામમાંથી વહે છે? - બ્રહ્મપુત્ર

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

331. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? - ગોદાવરી
332. સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય ક્યું ? - સિક્કિમ
333. ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા ક્યા નામથી ઓળખાય છે ? - રેડ ક્લિફ
334. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું ? - જીમ કોર્બેટ
335. ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યા અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? - ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઈ.સ.1862માં
336. સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકાતા અને ....શહેરને જોડે છે. - ચેન્નાઈ
337. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?
   - ઓક્ટોબર-નવેમ્બર

TET- II - ભાષા - 2015

338. કોને સાતપુડાની રાણી કહે છે ? - પંચમઢી

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

339. ભારતના ક્યા શહેરના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણસમય માનવામાં આવે છે ? - અલ્લાહાબાદ
340. ભારત વિશ્વમાં અગત્યનું ભૂ-રાજકીય સ્થાન ધરાવે છે કારણ કે... - તેની ત્રણે દિશામાં સમુદ્ર છે
341. એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે ? - 04 મિનિટ
342. ક્યો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્નભંડાર છે ?
   - ઉત્તરનું મેદાન
343. NAMTO (નેશનલ એટલાસ એન્ડ થેમિટેક મેપ ઓર્ગેનાઈઝેશન) સંસ્થા ક્યા શહેરમાં આવેલી છે ?
   - કોલકત્તામાં

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

344. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે ? - કૃષ્ણા
345. અલકનંદા અને ભાગીરથી ક્યા સ્થળ પાસે એકબીજાને મળે છે? - દેવપ્રયાગ
346. ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈ વે ક્યા શહેરોને જોડે છે ?
   - વારાણસી -કન્યાકુમારી
347. સરકારની 'રાષ્ટ્રીય વન નીતિ' અનુસાર દેશના દરેક ગામોમાં અને શહેરોમાં વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ શરૂ થઈ છે તેનું નામ શું છે ? - સામાજિક વનીકરણ યોજના
348. જંગલો અંગે સંશોધન કરતી 'ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ' ક્યા સ્થળે આવેલી છે ? - દેહરાદૂન
349. એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે ? - 4 મિનિટ
350. ભારતનું ક્યા ખારા પાણીનું સરોવર છે ?
   - પુલીકટ, ચિલ્કા, સાંભર
351. ક્યુ પર્વતીય શિખર ઉંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે છે ?
   - માઉન્ટ કેટુ (ગોડવિન)
352. હિમાલયના ક્યા ઘાટ દ્વારા કૈલાસ માનસરોવરની સરળ યાત્રાની શક્યતા ઊભી થઈ છે? - નાથુલા ઘાટ
353. ભારતમાં કોરોમંડલ કિનારે ક્યા પવનો શિયાળામાં વરસાદ લાવે છે ? - ઈશાન કોણીય મોસમી પવનો
354. 'રથ ઘંભોર' અને 'સરિસ્કા' ક્યા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે? - રાજસ્થાન

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર કલાર્ક - 2012

355. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે ? - રાજસ્થાન
356. સૌથી વધુ કોલસાની ખાણ ક્યા રાજ્યમાં આવેલી છે ?
   - ઝારખંડ
357. 'કાન્હા નેશનલ પાર્ક' ક્યા રાજ્યમાં આવેલ છે ? - મધ્ય પ્રદેશ
358. દેશનો સૌથી લાંબો પુલ 'મહાત્મા ગાંધી સેતુ' નીચેના પૈકી કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? - ગંગા
359. હિરાકુંડ બહુહેતુક યોજના બંધ ક્યા રાજ્યમાં આવેલ છે ?
   - ઓડિશા

જૂનિયર કલાર્ક પેપર - 1 - 2012

360. ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ ક્યો ઘાટ છે ?
   - ખરદુંગલા ઘાટ
361. ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે ?
   - અજંતા

TET- I - 2012/2014

362. ભારતીય સંઘનો દક્ષિણનો છેડો ક્યો છે ? - ઈંદિરા પોઈન્ટ
363. સૂચિત સુવર્ણ ચતુર્ભુજ ક્યા શહેરોને જોડશે ?
   - મુંબઈ-દિલ્હી-કોલકત્તા-ચેન્નાઈ

સબ ઓડિટર - 2015

364. પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ?
 - કોલસાની ખાણ

365. ભારતના ક્યા રાજ્યને 'ઘઉંનો કોઠાર કહે છે? - **પંજાબ**

366. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ક્યા ફળ વિશેષ થાય છે?
 - સફરજન

TAT - 2012

367. બંગાળનો અખાત મોટો અખાત છે. અખાતનો અર્થ શું છે?
 - જ્યાં જમીન અંદરની તરફ વળાંક લે છે ત્યાંના સમુદ્રનો પહોળો ફાંટો

HTAT - 2012

368. ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહ ક્યા નામે ઓળખાય છે?
 - મેઘના

PSI - 2012

369. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ ક્યો છે ? - **NH 7**

370. ભારતમાં નીચે જણાવેલ ક્યા રાજ્યમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે ? - **કેરળ**

371. ભારતમાં વર્ષનો ટુંકામાં ટુંકો દિવસ ક્યો છે ? - **22 ડિસેમ્બર**

372. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? - **આસામ**

373. સાચુ જોડકું - **કાન્હા રાષ્ટ્રીય પાર્ક : મધ્યપ્રદેશ,** સુલતાનપુર **રાષ્ટ્રીય પાર્ક : હરીયાણા, બાંદી રાષ્ટ્રીય પાર્ક : કર્ણાટક**

374. ક્યું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌ પ્રથમ બનાવવામાં આવ્યું છે ?
 - જિમ કોરબેટ રાષ્ટ્રીય પાર્ક

375. નીચેનામાંથી ક્યા ભારતીય ટાપુ પર સક્રિય જ્વાળામુખી મળે છે ? - **બૈરન ટાપુ**

એકાઉન્ટ ઓફિસર - 1999

376. હિમાલયની ગિરિમાળાઓમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ? - **શંકુદ્રુમ**

આંકડાકીય અધિકારી - 2000

377. માઉન્ટ એવરેસ્ટપછી વિશ્વનું બીજા નંબરનું ઊંચુ પર્વત શિખર ક્યું છે ? - **માઉન્ટ ગોડવિન ઓસ્ટિન (K2)**

378. ભારત દેશની પૂર્વથી પશ્ચિમ લંબાઈ - **2933 કિ.મી છે**

379. વસતીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટુ રાજ્ય - **ઉત્તર પ્રદેશ**

380. જોગનો ધોધ (ગેરસપ્પાનો ધોધ) કઈ નદી પર આવેલો છે ?
 - શરાવતી નદી, કર્ણાટક

381. જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ?
 - રાજસ્થાન

382. દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ?
 - નાગાર્જુન સાગર

383. ONGCનું મુખ્ય મથક ક્યા શહેરમાં છે ? - **દેહરાદૂન**

384. નર્મદા નદીનું મૂળ ક્યાં છે ?
 - વિંધ્ય પર્વતના અમરકંટકના ડુંગરમાં

385. ઓપરેશન ફ્લડની યોજના ક્યા હેતુથી અમલમાં મૂકવામાં આવી ? - **દૂધના ઉત્પાદનમાં વધારો**

386. ભારત-ચીનની સરહદ ક્યા નામે ઓળખાય છે ?
 - મેકમોહન રેખા

ચીફ ઓફિસર - 1999

387. હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ જણાવો. - **રત્નાકર**

વૈદકિય સેવા - 2000

388. ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ? - **અરવલ્લી**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

389. પીળા આરસ માટે ક્યું શહેર જાણીતું છે ? : **જૈસલમેર**

390. કોલારની ખાણમાંથી ક્યું ખનિજ પ્રાપ્ત થાય છે? : **સોનું**

391. લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું છે? : **સતલજ**

392. નૈઋત્ય અને વાયવ્ય ખુણાની વચ્ચે આવેલી દિશા કઈ છે ? : **પશ્ચિમ**

393. નાસિક કઈ નદીના કિનારે આવેલુ છે? : **ગોદાવરી**

394. ઝારખંડ ભારતના ક્યા પ્રાન્તમાંથી છૂટું પડ્યું ? : **બિહાર**

395. હિમ સરોવર ક્યા આવેલું છે ? - **વેરીનાગ**

396. ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? : **થારનું રણ**

397. ગોંડ નામક આદિવાસી મુખ્યત્વે ક્યા રાજ્યમાં રહે છે ? : **મધ્ય પ્રદેશ**

398. ભારતના ક્યા રાજ્યમાં જંગલનો વિસ્તાર સૌથી વધુ છે ? : **મધ્ય પ્રદેશ**

399. ચંબલ નદી કઈ નદીને મળે છે ? : **યમુના**

400. પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે? : **181 અક્ષાંશ**

401. એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? : **4 મિનિટ**

402. નર્મદા નદીનું મૂળ અમરકંટક ક્યા રાજ્યમાં છે ? : **મધ્ય પ્રદેશ**

403. અરુણાચલ પ્રદેશ દેશના ક્યા ખુણામાં આવેલું છે ? : **ઈશાન**

404. કેરીની કઈ જાત સાથે રત્નાગીરીનું નામ જોડાયેલું છે? : **હાફુસ**

405. ગ્રીનિચ સમય અને ભારતીય સમય વચ્ચે કેટલા સમયનો તફાવત છે ? : **5 કલાક 30 મિનિટ**

406. બેક વોટર ભારતના .... કાંઠે છે. - **પશ્ચિમ**

407. તેલ શુદ્ધિકરણનું કારખાનું ધરાવનાર દિગ્બોઈ ક્યા આવેલું છે? : **આસામ**

408. 'ભૂપેન હઝારિકા સેતુ' ક્યા બે રાજ્યોને જોડતો પુલ છે ? - **આસામ - અરુણાચલ પ્રદેશ**

409. નદીઓ અને ઉપનદીઓનું યોગ્ય જોડકું જોડો. - **ક્રિષ્ના-તુંગભદ્રા, બ્રહ્મપુત્રા-લોહિત, ગોદાવરી-ઈન્દ્રાવતી, યમુના-ચંબલ**

410. ભારતના કેટલા રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે ?- **4**

411. ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો. - **સૂર્યમંડળ**

412. વર્લ્ડ બેંકે .... વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ-1ની ક્ષમતાવર્ધન માટે લોન મંજૂર કરી ? - **પશ્ચિમ બંગાળમાં હલ્દિયા અને ઉત્તર પ્રદેશમાં વારાણસી**

413. દોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે ક્યા સરહદી બિંદુ થકી દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ થયો ? - **નાથુલા**

414. પશ્ચિમી પવનો કોની વચ્ચે વાય છે ? - **અક્ષાંશ 35° અને 65° ઉત્તર અને દક્ષિણ બંને**

415. રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? - **કટક**

416. નૈનીતાલ ક્યા રાજ્યમાં આવેલું છે ? - **ઉત્તરાખંડ**

417. ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જણાવો. - **ગુજરાત**

418. ઘાટી અને રાજ્યનું યોગ્ય જોડકું જોડો. - **બનીહાલઘાટી-જમ્મુ-કાશ્મીર, કૂંજન ઘાટી- હિમાચલ પ્રદેશ, ડોંગકાલા ઘાટી- સિક્કિમ, હલ્દી ઘાટી- રાજસ્થાન**

419. રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે ? - **ગોદાવરી**

420. ચુલ્લા ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ? - **રાજસ્થાન**

421. ભારતમાં બીટી કપાસનો પ્રવેશ કોણે કરાવ્યો ? - **માયકો અને મોન્સેંટોના સંયુક્ત સાહસથી**

422. કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યા આવેલ છે ? - **રાજમુંદ્રી**

423. હવા, વૃષ્ટિ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ? - **વાતાવરણ**

424. ક્યા રાજ્યમાં વિશ્વનો સૌથી બીજો જૂનો ખડક શોધાયો હતો ? - **ઓડિશા**

425. લોઢ ધોધ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? - **ઝારખંડ**

426. ભૂગોળ ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન જણાવો. - **પૃથ્વીનો વ્યાસ**

427. માઉન્ટ હેરીયેટ નેશનલ પાર્ક ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ? - **આંદામાન-નિકોબાર**

428. પશ્ચિમી વિક્ષોભ જે ભારતમાં ઠંડીની ઋતુમાં કઈ બાજુથી પ્રવેશ કરે છે ? - **પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ**

429. સોરો ઓફ બંગાલ કઈ નદીને કહેવામાં આવે છે ? - **દામોદર નદી**

430. ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર ક્યું છે ? - **કોલકત્તા**

431. સુંદરગઢ કઈ ખનિજના ઉત્પાદન ક્ષેત્રે જાણીતું છે ? - **લોખંડની કાચી ધાતુ**

432. ચંબા પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ? - **હિમાચલ પ્રદેશ**

433. 'ઓફ ગ્રીડ પાવર' એટલે શું ? - **દૂર રહેતા સમૂહો માટે વિકેન્દ્રિત પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓમાં ઉત્પાદિત થયેલ ઊર્જા**

434. કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ? - **નાગપુર**

435. ખનીજ, દ્રવ્ય, જમીન, ઢોળાવ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ? - **મૃદાવરણ**

436. તાજેતરમાં કેન્દ્ર સરકારે 'ઉત્તર કોયલ જળાશય પરિયોજનાને' પરિપૂર્ણ કરવા સારુ મંજૂરી આપી છે. સદરહુ પરિયોજના ક્યા આવેલી છે ? - **ઝારખંડ**

437. ક્યા રાજ્યને ભારતના સેન્દ્રીય ખેતી રાજ્ય તરીકે જાહેર કરેલ છે ? - **સિક્કિમ**

438. ભારતનો બોગીબિલ પુલ એટલે શું ? - **ભારતનો સૌથી લાંબો રેલ રોડ પુલ**

439. કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - **મધ્ય પ્રદેશ**

440. ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે તેથી ....ખાતરની માંગ સતત વધતી રહેલી છે. - **રાસાયણિક**

441. ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? - **લખનઉ**

442. કલીમપોંગ પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ? - **પશ્ચિમ બંગાળ**

443. સેન્દ્રીય દ્રવ્ય ક્યા આવરણમાં જોવા મળે ? - **જીવાવરણ**

444. પશ્ચિમી વિક્ષોભ ક્યા ઉત્પન્ન થાય છે ? - **ભૂમધ્ય સમુદ્ર**

445. ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ? - **બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર**

446. નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? - **સિક્કિમ**

447. નંદપુહા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - **અરુણાચલ પ્રદેશ**

448. ક્યો ઘાટ અરુણાચલ પ્રદેશને તીબેટ સાથે જોડે છે ? - **બોમડીલા**

449. નાગાર્જુન સાગર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - **તેલંગાણા**

450. બાલાઘાટ કઈ ખનિજ માટે જાણીતું નામ છે ? - **મેંગેનીઝ**

451. ભારતનું સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય ક્યું છે ? - **કેરળ**

452. રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરનું કારખાનું ક્યા આવેલું છે? - **મહારાષ્ટ્ર**

453. બ્લુ માઉન્ટેન કોને કહેવામાં આવે છે ? - **નીલગીરી પર્વતો**

454. ભારતમાં કાળા મરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ક્યું છે ? - **કેરળ**

455. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ? - **બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર**

456. ક્યા રાજ્યએ તાજેતરમાં ક્રિષ્ના અને ગોદાવરી નદીનું જોડાણ કર્યું ? - **આંધ્ર પ્રદેશ**

457. વાલ્મિકી નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં સ્થિત છે ? - **બિહાર**

458. ભારતનો બગીચો કોને કહેવામાં આવે છે ? - **બેંગલુરુ**

459. પશ્ચિમ બંગાળનું સુંદરવન કઈ બાબત માટે જાણીતું છે ? - **મેન્ગ્રોવ વનસ્પતિ**

460. અયનાંતનો દિવસ કાં તો ? - **વર્ષનો સૌથી લાંબો દિવસ (ઉનાળુ અયન) અથવા વર્ષનો સૌથી ટૂંક દિવસ (શિયાળુ અયન)**

461. લડાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે ? - **બૌદ્ધ મઠ**

462. ઈરાનના ચાબહાર બંદર પર ભારત પ્રથમ તબક્કામાં કેટલા ધક્કા તૈયાર કરવાનું અને ચલાવવાનું આયોજન છે ? - **2 ધક્કા**

463. ઝિંઝિબાર સ્યુડો સ્વોરોસમ શું છે ? - **અંદામાન-નિકોબાર ટાપુ પર મળી આવેલ આદુની નવી પ્રજાતિ**

464. સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? - **રાજસ્થાન**

465. ભારતનો વસતી વૃદ્ધિદર ન્યૂનતમ ક્યારે હતો ? - **1911-21**

466. અન્શી નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - **કર્ણાટક**

467. જ્યારે સમશીતોષ્ણ ચક્રવાતનો મધ્યભાગ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય છે ત્યારે હવામાન ....રહે છે. - **ચોખ્ખુ**

468. કોસી સિંચાઈ યોજના સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - **બિહાર**

469. તવા સિંચાઈ યોજના ક્યા રાજ્યમાં જોવા મળે ? - **મધ્ય પ્રદેશ**

470. કુનડાહ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થિત છે ? - **તમિલનાડુ**

471. લૂ એ ક્યા પ્રકારનો પવન છે ? - **સ્થાનિક પવન**

472. ફૂટલૂઝ ઉદ્યોગ એટલે શું ?
- **એવા ઉદ્યોગો જે વિશેષ સ્થાન સાથે જોડાયેલા નથી**

473. ડુગોંગ શું છે ? - **સમુદ્રી ગાય**

474. ભારતમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ? - **મધ્ય પ્રદેશ**

475. સતકોસી વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? - **ઓરિસ્સા**

476. સૂર્ય તરફની ધરતીની બાજૂનું સરેરાશ તાપમાન આશરે..... રહે છે. - **17^0 સે.**

477. ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ? - **1961-71**

478 કાર્ડેમોમ ટેકરીઓ ક્યા આવેલી છે ? - **દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તમિલનાડુ**

479. તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ? - **આંધ્ર પ્રદેશ**

480. સિક્યુરિટી પેપર મિલ્સ ક્યા રાજ્યમાં આવેલી છે ? - **મધ્ય પ્રદેશ**

481. દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? **- પ્રથમ**

482. ભૂગોળ ક્ષેત્રે ભાસ્કરાચાર્યનું સંશોધન જણાવો. - **ગુરુત્વાકર્ષણ**

483. સ્થળો અને શહેરોનો યોગ્ય જોડકા જોડો.
- આનંદ ભવન-અલ્હાબાદ, દેલવાડાના મંદિરો-માઉન્ટ આબુ, ગેટ વે ઓફ ઈન્ડિયા-મુંબઈ, વિજયઘાટ-દિલ્હી

484. ક્યા કારણો સમુદ્રની ખારાશને અસર કરે છે ? - **બાષ્પીભવન, વરસાદ, પવન અને દબાણ**

485. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર સાક્ષરની શ્રેણીમાં સમાવેશ કરેલ છે ? - **જેની વય 7 વર્ષ અથવા વધુ હોય અને તે કોઈપણ ભાષા સમજી, લખી અને વાંચી શકે છે**

486. રોકીઝની રચના, ભારતની એશિયા સાથે અથડામણ અને હિમાલય અને આલ્પ્સની રચના ક્યા યુગમાં બની હતી ? - **સીનોઝોઈક યુગ**

487. ભારતમાં આવેલો વિશ્વનો સૌથી વધુ વસતી ગીચતા ધરાવતા પ્રદેશોમાનો એક પ્રદેશ.... - **સિંધુ-ગંગાના મેદાનો**

488. વેટલેન્ડ અને તેના રાજ્યોને યોગ્ય ગોઠવો. - **વેલુર-આંધ્ર પ્રદેશ, ચીલ્કા-ઓડિશા, સાંભર-રાજસ્થાન, કાબર-બિહાર**

489. તારાપુર એટમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં સ્થિત છે? - **મહારાષ્ટ્ર**

490. હજાર વ્યક્તિદીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે... - **જન્મદર**

491. ભારતમાં આવેલ અભયારણ્ય અને રાજ્યના યોગ્ય જોડકા ગોઠવો. - **માલન-ઉત્તરાખંડ, સોમેશ્વર-કર્ણાટક, ડોમ્કા-મીઝોરમ, જલડપરા-પશ્ચિમ બંગાળ**

492. ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ? - **ધરમપુર**

493. લોકસ્ટ વોર્મિંગ ઓર્ગેનાઈઝેશન ક્યા આવેલું છે ? - **જોધપુર**

494. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ નામક રાષ્ટ્રીય સંસ્થા ક્યા આવેલી છે ? - **જયપુર**

495. વનસ્પતિ જનીન બેંક.........સંરક્ષિત કરે છે. - **બીજ અને કલમ બન્ને**

496. પેટલૈંડ્સ કઈ ખનિજના ઉત્પાદન માટે જાણીતું છે ? - **બોક્સાઈટ**

497. સુંદરવન મેન્ગ્રોવ ક્યા જોવા મળે ? - **પશ્ચિમ બંગાળ**

498. બાલફાક્રમ નેશનલ પાર્ક ક્યા આવેલો છે ? - **મેઘાલય**

499. કોટા એટમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? - **રાજસ્થાન**

500. ભૂપૃષ્ઠની દષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય ? - **પાંચ**

501. નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ? - **કરનાલ**

502. હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે ? - **ત્રણ**

503. સમગ્ર વિશ્વમાં સરેરાશ અપેક્ષિત આયુષ્ય હાલમાં....- **વધી રહ્યું છે.**

504. લોરીંગા મેન્ગ્રોવ ક્યા રાજ્યમાં સ્થિત છે ? - **આંધ્ર પ્રદેશ**

505. ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે ? - **ચિનાબ**

506. જળ વિદ્યુત ઉત્પાદન કરવાની પાયકારા પરિયોજના ક્યા રાજ્યમાં છે? - **તમિલનાડુ**

507. પરાલી-I ટાપુ કે જે જૈવવિવિધતાથી ભરપુર નિર્જન......... ટાપુનો ભાગ હતો તે તટવર્તીય ધોવાણને કારણે અદશ્ય થઈ ગયો. - **લક્ષદ્વિપ**

508. ભૂગોળવિદ બ્રહ્મગુપ્તનું યોગદાન શું છે ? - **ખગોળશાસ્ત્ર**

509. કચ્છના રણથી કન્યાકુમારી સુધીનું વિસ્તરણ ક્યા મેદાનો કહેવાય ? - **પશ્ચિમી તટવર્તીય મેદાનો**

510. લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - **ઉત્તરાખંડ**

511. રેલવે એન્જિનોનું નિર્માણ ઝારખંડમાં ક્યા સ્થળે થાય છે ? - **જમશેદપુર**

512. ઓઝોન સ્તર મુખ્યત્વે.....છે. - **સમતાપ મંડળના નીચલા ભાગમાં**

513. સેન્ટ્રલ શીપ બ્રિડિંગ ફાર્મ ક્યા શહેર સાથે સંબંધિત છે ? - **હિસાર**

514. જળવિદ્યુત ઉત્પાદન કરવાની મહાત્મા ગાંધી પરિયોજના ક્યા રાજ્યમાં આકાર પામેલી છે ? - **કર્ણાટક**

515. .... એવા છિછરા પાણીના જથ્થા છે કે જે પાણીના મોટા જથ્થાથી અવરોધો અથવા ફાટાથી અલગ પડેલા હોય. - **લગૂન**

516. કુંદાપર મેન્ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલ છે ? - **કર્ણાટક**

517. ભારત દેશ ક્યા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલું છે ? - **$8^0 4'$ થી $37^0 6'$ ઉત્તર અક્ષાંશ અને $68^0 7'$ થી $97^0 25'$ પૂર્વ રેખાંશ**

518. કાઈગા એટોમિક પાવર સ્ટેશન ક્યા આવેલું છે ? - **કર્ણાટક**

519. ઉત્તરમાં ગંગા મુખત્રિકોણથી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી લંબાયેલ છે તેને ક્યા મેદાનો કહેવાય ? - **પૂર્વ તટવર્તીય મેદાનો**

520. ભારતમાં ભૂમિ ધોવાણની સમસ્યા કઈ ટેવ સાથે સંકળાયેલી છે? **- વન નાબૂદી**

521. એનીમલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ નામની રાષ્ટ્રીય સંસ્થાનું શહેર જણાવો. - **જલંધર**

522. ઓઝોન સ્તરની જાડાઈ ....માં મપાય છે. - **ડોબસન એકમ**

523. ધોધ અને રાજ્યોનું યોગ્ય જોડકું જોડો. - **બુંદલા ધોધ-હિમાચલ પ્રદેશ, ચૈલીયા ધોધ-રાજસ્થાન, સદની ધોધ-ઝારખંડ, ઝનઝરી ધોધ-ગુજરાત**

524. કેનાલ અને રાજ્યોનું યોગ્ય જોડકું જોડો. - **સેતુ સમુદ્રમ કેનાલ પ્રોજેક્ટ-તમિલનાડુ-કેરળ, તેલગુ ગંગા પ્રોજેક્ટ-આંધ્ર પ્રદેશ, તાજીવાલા કેનાલ-હરિયાણા**

525. હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિ. આવેલું છે ? - **રાંચી**

526. ડેક્કન ઉચ્ચ પ્રદેશ કઈ પર્વતમાળાની દક્ષિણે સ્થિત છે ? - **સાતપુડા**

527. શેરડી ઉગાડતા વિસ્તારો પાસે કઈ ચીજવસ્તુની મીલો જોવા મળે? - **ખાંડની**

528. જાવા ટાઈગર નામક વાઘની પ્રજાતિ વિલુપ્ત થઈ ગયેલ છે, આ વિધાન... - **સત્ય છે.**

529. શહેરી વિસ્તારોમાં રાજ્યની 10% વસતી ધરાવતું..... સૌથી ઓછું શહેરીકરણવાળુ રાજ્ય છે. - **હિમાચલ પ્રદેશ**

530. પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સૂર્યાઘાત ક્યા સ્થળે થાય છે? - **ઉષ્ણ કટિબંધના રણ**

531. ભૂગર્ભ જળોના વધુ ઉપયોગથી હાનિકારક અસરો કઈ છે? - **ફ્લોરાઈડની માત્રા વધવી, હાનિકારક ક્ષારોનું પ્રમાણ વધવુ**

532. ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્ટિટ્યૂટ ક્યા આવેલું છે? - **બરેલી**

533. કઈ નવી રાષ્ટ્રીય નીતિ અનુસાર પ્રાકૃતિક સૌંદર્યનું રક્ષણ કરવું, રણ વિસ્તારને આગળ વધતો અટકાવવો તેમજ પર્યાવરણનું સમતુલન ટકાવવાનો પ્રયત્ન થાય છે? - **1988ની**

534. ઉત્તરીય ઓડિશાથી નીલગીરી ટેકરીઓ સુધી ભારતના પૂર્વીય દરિયાકિનારા સુધીનો ફેલાવાને ક્યા ઘાટ તરીકે ઓળખાશે? - **પૂર્વ ઘાટો**

535. નેશનલ ઈન્સ્ટુમેન્ટ ફેક્ટરી ક્યા આવેલ છે? - **કોલકાતા**

536. વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત્ત પર હવાનું દબાણ કેવું હોય છે? - **હલકુ**

537. સંકટગ્રસ્ત જાતિઓની IUCN રેડ ડેટા બુક......ની જાતિઓની સંરક્ષણની સુચિ છે. - **પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ**

538. ભારતમાં વસતી ગણતરી (સેન્સસ)ની કાર્યવાહી ક્યા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે? - **ગૃહ મંત્રાલય**

539. ભારતમાં તેલંગાણા રાજ્યની રચના પછી કુલ કેટલા રાજ્યો તટવર્તીય સહભાગીતા ધરાવે છે? - **9**

540. ઝોજીલા ઘાટ સાથે જોડાયેલું રાજ્ય જણાવો. - **જમ્મુ કાશ્મીર**

541. નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન અનુસાર ભારતમાં દુષ્કાળનું મુખ્ય કારણ.............છે. - **યોગ્ય વિતરણ વ્યવસ્થાઓ અભાવ**

542. રેલવે એન્જિનોનું નિર્માણ કાર્ય ઉત્તર પ્રદેશમાં ક્યા થાય છે? - **વારાણસી**

543. રેલવેના મુસાફરો માટેના ડબ્બા ક્યા બને છે? - **પેરામ્બુર, બેંગલોર, કપુરથલા, કલકત્તા**

544. શહેરી વિસ્તારોમાં રાજ્યની 61% વસતી ધરાવતું..... સૌથી વધુ શહેરીકરણવાળુ રાજ્ય છે. - **ગોવા**

545. પાછા ફરતા મોસમી પવનો ભારતમાં કઈ બાજુ જાય છે? - **ભારતના ભૂમિ ભાગો તરફથી સમુદ્ર તરફ**

546. નેશનલ બ્રેઈન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? - **માનેસર**

547. દક્ષિણ ભારતમાં આવેલા પર્વતોમાં સૌથી ઊંચો પર્વત ક્યો છે? **-અનાઈમુડી (કેરળ)**

548. ડાંગર ક્યા પ્રકારનો પાક છે? - **ઉષ્ણકટિબંધીય ખરીફ પાક**

549. ભારતીય રેલવે એ લાર્સન એન્ડ ટુબ્રો સાથે રેલવે વિદ્યુતીકરણ માટે પ્રથમ ઈ.પી.સી (EPC) કરાર કર્યો. ઈપીસીનું પુરૂ નામ શું છે? - **એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન**

550. ઉપનદી પૂર્ણા કઈ મુખ્ય નદીને મળે છે? - **તાપી**

551. ભારતના કેટલાક ભાગોમાં લાલ માટી મળી આવે છે. આ માટીના લાલ રંગનું શું કારણ છે? - **ફેરિક ઓક્સાઈડની હાજરી**

552. ....એવું પાણી છે કે જે સમુદ્રના વિરુદ્ધ પ્રવાહના અવરોધના કારણે પોતાના માર્ગમાં પાછું વળે છે. - **ભરતી**

553. પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી ક્યું છે? - **શાહમૃગ**

554. રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? - **મેંગેનીઝ**

555. મહોગની વૃક્ષ ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે? - **ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો**

556. ગારો, ખાસી, અંગામી, લોથા ભારતના ક્યા વિસ્તારમાં જોવા મળતી આદિજાતિઓ છે? - **ઉત્તર-પૂર્વ ભારત**

557. દરિયાની કઈ બાબતને કારણે મોટા વહાણો બંદર સલામત રીતે છોડી શકે છે? - **ભરતી-ઓટ**

558. તારાનું તેજ તેના .... પર નિર્ભર કરે છે. - **કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર**

559. ભારતમાં પાછા ફરતા મોસમી પવનો સંદર્ભે તાપમાન વિશે જણાવો. - **રાત્રી ઠંડી અને દિવસે તાપમાન વધી જાય**

560. ભારતીય દ્વિપકલ્પનું દક્ષિણ તરફનું સૌથી છેવાડાનું બિંદુ કન્યાકુમારી ....છે. - **વિષુવવૃત્તની ઉત્તરે**

561. નેલ્લોર ક્યો ખનિજના ઉત્પાદન ક્ષેત્રે આગળ છે? - **અબરખ**

562. પોલાદ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? - **મેંગેનીઝ**

563. તુંગનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે? - **ઉત્તરાખંડ**

564. ખીજડો વૃક્ષ ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે? - **ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો**

565. ઈન્ડિયન રોલર પક્ષી ક્યા રાજ્યમાં રાજ્યપક્ષી તરીકે ગણવામાં આવે છે? - **આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા**

566. લક્ષદ્વીપ ટાપુ કઈ ડિગ્રી ચેનલથી અલગ પડે છે? - **નાઈન ડિગ્રી ચેનલ**

567. આપણે ઘડિયાલ મગરને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં જોવા માંગતા હોય તો ક્યું સ્થળ શ્રેષ્ઠ ગણાય? - **ચંબલ નદી**

568. ભારતની કઈ બાજુએ આંદામાન-નિકોબાર ટાપુઓ આવેલા છે? - **પૂર્વ તરફના બંગાળના ઉપસાગરમાં**

569. દેશમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મેનગ્રુવ આવરણ છે? - **પશ્ચિમ બંગાળ**

570. દરિયામાં....... કારણે સીલ્ટ (કાંપ) દૂર થાય છે? - **ભરતી-ઓટ**

571. પ્લાયા શબ્દ શાના માટે પ્રયોજાય છે? - **ખારા કે નમકના સરોવરો**

572. સીંગર ભીલ એરપોર્ટ ક્યા આવેલું છે? - **અગરતલા**

573. મેંગેનીઝના વિશ્વના કુલ જથ્થાનો અંદાજિત કેટલા ટકા જથ્થો ભારતમાં છે? - **20%**

574. દેશમાં ખાદ્ય પદાર્થના ઉત્પાદન માટે ક્યા પાક માટે મહત્તમ જગ્યા વાવણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે? - **ડાંગર**

575. સુંદરીના વૃક્ષો ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે? - **ભરતીના જંગલો**

576. કંડલાને ક્યા પ્રકારનું બંદર કહેવાય? - **ટાઈડલ પોર્ટ**

577. ફ્લોરાઈડ, આર્સેનિક, યુરેનિયમ ક્યું પ્રદૂષક છે? - **જળ પ્રદૂષક**

578. ગુજરાતના ક્યા જિલ્લામાં મેંગેનીઝનો 26 કિ.મી. લાંબો પટ્ટો છે? - **પંચમહાલ**

579. ....પછી ભારતનો ભૂકંપલગન ઝોનીંગ નકશો સુધારવામાં આવ્યો. - **લાતુર ભૂકંપ**

580. ઉપનદી પ્રન્હિતાનું મુખ્ય નદી સાથેનું જોડાણ જણાવો.- **ગોદાવરી**

581. સ્પ્રુસ વૃક્ષો ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે ? - **શંકુદ્રુમ જંગલો**

582. ભારતના કઈ બાજુના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓ છે ? - **પશ્ચિમ તરફના**

583. ભારતમાં સૌથી જૂની કાર્યરત કઈ રિફાઈનરીને ગંગોત્રી ઓફ ધ ઈન્ડિયન હાઈડ્રોકાર્બન સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે ? - **દિગ્બોઈ**

584. રોહતાંગ લા ઘાટ સાથે ક્યું રાજ્ય સંકળાયેલું છે ? - **હિમાચલ પ્રદેશ**

585. કિલ્લાઓ અને રાજ્યોનું યોગ્ય જોડકું જોડો. - **કાંગડાનો કિલ્લો-હિમાચલ પ્રદેશ, જંજિરાનો કિલ્લો-મહારાષ્ટ્ર, માંડુનો કિલ્લો-મધ્ય પ્રદેશ, ભૂજીયા હીલ કિલ્લો- ગુજરાત**

586. ક્યા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે ? - **એરંડા (દિવેલા)**

587. મચ્છીમારી માટે દરિયાની ભરતી ઓટ જરૂરી છે, આ વિધાન ? - **સાચું છે**

588. ભારતમાં પશ્ચિમ ઘાટની પવનની દિશાને શું કહેશું ? - **સૌથી વધુ વરસાદના વિસ્તારો**

589. પ્લાયા ભારતના ક્યા એક ભાગની ભૌગોલિક વિશેષતા છે ? - **ભારતના પશ્ચિમી રાજ્યનો**

590. ભારતના ક્યા રાજ્યનો ઉત્તરનો ભાગ પ્રમાણમાં ઉજજડ અને સૂકો છે ? - **ગુજરાત**

591. પ્રોજેક્ટ અને નદી અંગેનું જોડકું જોડો. - **રાજઘાટ ડેમ પ્રોજેક્ટ-બેતવા, સલાલ પ્રોજેક્ટ- ચીનાબ, નાગાર્જુન સાગર પ્રોજેક્ટ-ક્રિષ્ના, જયકવાડી પ્રોજેક્ટ-ગોદાવરી**

592. ભાખરા બંધ કઈ નદી પર આવેલો છે ? - **સતલજ**

593. ઉપનદી કોયનાનું મુખ્ય નદી સાથેનું જોડાણ ક્યું છે ? - **કૃષ્ણા**

594. શહેર અને નદીનું જોડકું જોડો. - **હૈદરાબાદ-મુસી, પંઢરપુર-ભીમા, સંબલપુર-મહાનદી, લુધિયાણા-સતલજ**

595. દ્વીપકલ્પીય નદી ક્રિષ્ના કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? - **સહ્યાદ્રી**

596. હાથી માટે અનામત ક્ષેત્ર અને રાજ્યની જોડ ગોઠવો. - **મયુરભંજ-ઓડિશા, ધનસીરી લુંગડીંગ-આસામ, ઈન્ટંકી-નાગાલેન્ડ, પેરિયાર-કેરળ**

597. રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ? - **મહારાષ્ટ્ર**

598. ક્રિષ્ના સાગર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ? - **કર્ણાટક**

599. હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરાનાંગલ ડેમ કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે ? - **સતલજ નદી**

600. માન સરોવરમાંથી કઈ નદી નીકળે છે ? - **સતલજ**

601. રાણીગંજ શાના માટે જાણીતું સ્થળ છે ? - **કોલસાની ખાણ**

602. ભારતમાં સામાન્યતઃ કઈ તારીખે ટૂંકામાં ટૂંકી રાત હોય છે ? - **21 જૂન**

603. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ક્યાથી ઉદ્ભવે છે ? - **ત્ર્યંબકના ડુંગરમાંથી**

604. ભોટિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ? - **ઉત્તરાખંડ**

605. ભારત 8°4' ઉત્તર અક્ષાંશથી......... ઉત્તર અક્ષાંશ વચ્ચે ફેલાયેલો વિશાળ અને સમૃદ્ધ દેશ છે. - **37°6'**

606. મેટ્ટુર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - **તમિલનાડુ**

607. બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં છે તો સાંચીનો સ્તુપ ક્યા આવેલો છે ? - **મધ્ય પ્રદેશ**

608. સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ? - **મધ્ય પ્રદેશ**

609. હાલમાં ભારતનું ક્યું રાજ્ય સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરે છે ? - **મહારાષ્ટ્ર**

610. ભારતમાં ક્યું રાજ્ય પવન ઊર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પાદન કરે છે ? - તમિલનાડુ

611. સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ.......માં બંધાશે. - **અગત્તી હવાઈ મથક, લક્ષદ્વીપ**

612. મુરિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ? - **છત્તીસગઢ**

613. તાડોબા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - **મહારાષ્ટ્ર**

614. સિક્કિમ રાજ્ય..........થી ઘેરાયેલું છે. - **ચાઈના, નેપાળ, ભૂટાન અને પશ્ચિમ બંગાળ**

615. બિલાસપુર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ? - **રાજસ્થાન**

616. ભારતના વિસ્તારોમાંથી ક્યા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે ? - **ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં**

617. ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો ક્યા આવેલી છે ? - **મહારાષ્ટ્ર**

618. બીજાપુર (કર્ણાટક) શા માટે પ્રખ્યાત છે ? - **ગોળ ગુંબજ**

619. ક્યા રાજ્યનાં પવન ઊર્જા માટેની મહત્તમ સંભાવના છે ? - **તમિલનાડુ**

620. ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ ક્યો છે ? - **NW4 કાકીનાડાથી પોંડીચેરી**

621. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? - **કૃષ્ણા**

622. ગદ્દી આદિજાતિનો વસવાટ ક્યા રાજ્યમાં છે ? - **હિમાચલ પ્રદેશ**

623. ભારતમાં આવેલ કુલ રાજ્યોની સંખ્યા જણાવો. - **29**

624. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હઝારિકા સેતુ ક્યા બે રાજ્યોને જોડે છે ? - **આસામ-અરૂણાચલ પ્રદેશ**

625. ભારતમાં સૌથી છેલ્લે ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી? - **તેલંગાણા**

626. હાલમાં સેલાપાસ પાસે ટનલ બનાવવાનું આયોજન છે તે સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ? - **અરુણાચલ પ્રદેશ**

627. નેશનલ પાવર ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે ? - **ફરીદાબાદ**

628. ભારતની કુલ વસતીના ટકાવારીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે. બીજા ક્રમાંક પર ક્યું રાજ્ય આવે છે ? - **મહારાષ્ટ્ર**

629. જ્યા નદીઓના પુરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે ? - **બાંગર**

630. બામરુલી એરપોર્ટ ક્યા આવેલું છે ? - **અલાહાબાદ**

631. મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે ? - **ગોવા**

632. અલકનંદા અને ભગીરથી નદી પરસ્પર ક્યા મળે છે ? - **દેવપ્રયાગ**

633. ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે ? - **ઉત્તર પ્રદેશ**

634. કેરળ અથવા અંદમાન દ્વિપસમૂહમાં દિવસ-રાત્રિના તાપમાનમાં સામાન્ય રીતે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો તફાવત રહે છે ? - **7° સે. કે 8° સે**

635. હાલમાં મહાનદીના વિવાદને ટ્રિબ્યુનલને સોંપવાનો નિર્ણય થયેલ છે તે ક્યા રાજ્ય વચ્ચેનો વિવાદ દૂર કરશે ? - **ઓરિસ્સા અને છત્તીસગઢ**

636. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ક્યા ક્રમે આવે છે ? - **બીજા**

637. ક્યા રાજ્યમા મેંગેનીઝનું ઉત્પાદન વધુ થાય છે ? - **ઓડિશા**

638. ભારતના સિંચાઈ ક્ષેત્રમાં કૃષિ યોગ્ય જમીન ક્યા કારણસર લવણીય/ ખારાશવાળી થઈ રહી છે ? - **અતિ સિંચાઈ**

639. રુદ્રમાતા એરપોર્ટ ક્યા આવેલું છે ? - **ભૂજ**

640. ભારતમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ક્યા પ્રકારના જંગલો આવેલા છે ? - **ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો**

641. ભુરસિંઘ ધ બારાસિંગા ક્યા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે ? - **કાન્હા**

642. વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો. - **પહેલો**

643. 19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસતી કેટલી ? - **512 મિલિયન**

644. મહેશ્વર જળ ઊર્જા પરિયોજના કઈ નદી પર આવેલ છે ? - **નર્મદા**

645. બંદીપુર નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - **કર્ણાટક**

646. હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ ? - **યુરિયા પદ્ધતિ**

647. ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે ? - **પંજાબ**

648. મૈથિલી, ભોજપુરી અને માગધી ક્યા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ? - **બિહાર**

649. ગંગાના પ્રવાહનો એક ફાંટો પં.બંગાળ (ભારત)માં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે તે ક્યા નામે ઓળખાય છે ? - **પદ્મા**

650. ક્યું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે ? - **અંબાલા**

651. જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે ? - **નર્મદા**

652. ....તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે સામુદ્રધુની છે. - **પાક સામુદ્રધુની**

653. પૃથ્વી સપાટીથી ઊંચે જતા સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે ? - **6.5° સે.**

654. ચાર મહાનગરોને જોડનાર રાષ્ટ્રીય સડમાર્ગો સાથે સંકળાયેલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની કુલ લંબાઈ .... કિ.મી. છે. - **5,846**

655. બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે ? - **111 કિ.મી.**

656. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે ? - **81,251**

657. ગંગા, ગોદાવરી, મહી નદી ડેલ્ટા બનાવે છે જ્યારે તાપી નદી ડેલ્ટા બનાવતી નથી, આ વિધાન ? - **સાચું છે**

658. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે ? - **કાવેરી**

659. મૂસા પરમજીતીઆના, જંગલી કેળાની એક નવી જાતની શોધ.....માં થઈ છે. - **અંદામાન અને નિકોબાર ટાપુઓ**

660. ડુગોંગ શું છે ? - **સમુદ્રી ગાય**

661. અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે ? - **તેઓ બધા કોરલ (પરવાળા) મૂળના છે.**

661. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? - **બિલાસપુર**

662. શુદ્ધ લોખંડની ગુણવત્તા અને ટકાવારી મુજબ લોહઅયસ્કોના પ્રકારોને વધતા ક્રમમાં ગોઠવો. - **સીડરાઈટ, લીમોનાઈટ, હીમેટાઈટ, મેગ્નેટાઈટ**

663. ભારતમાં જમીન સુધારણા બાબતે યોગ્ય બાબત જણાવો. - **ગણોત સુધારાઓ, કુટુંબદીઠ જમીન ટોચ મર્યાદાનો નિર્ધાર, જમીનોનું એકીકરણ**

664. ભારતના ક્યા વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલ, સદાબહાર (એવરગ્રીન) જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે ? - **આંદામાન અને નિકોબાર ટાપુઓ**

665. 2011ની વસ્તી ગણતરી અનુસાર ક્યા રાજ્યએ જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો દર્શાવ્યો છે ? - **જમ્મુ અને કાશ્મીર**

666. ક્યા પાકોનું પરિભ્રમણ કરવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપર આધાર રાખવાનું ઓછું થશે ? - **ચણા અને ચોખા**

667. કપાસના પાક માટે કેટલું તાપમાન અનુકૂળ છે ? - **21 ડિગ્રી સે.થી 28 ડિગ્રી સે.**

668. મરીન નેશનલ પાર્ક સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - **ગુજરાત**

669. તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મૂકાયેલ 'ભૂપેન હજારિકા બ્રિજ' બ્રહ્મપુત્રા નદીની કઈ ટ્રીબ્યુટરી નદી ઉપર બાંધતામાં આવેલ છે ? - **લોહિત નદી**

670. તોડા, સુમાલી, ઈરુલા, યુરાલી ક્યા વિસ્તારમાં જોવા મળતી મુખ્ય આદિજાતિઓ છે ? - **કેરળ**

671. ક્યુ લોખંડ-પોલાદ કેન્દ્ર ઝારખંડમાં છે ? - **બોકારો પોલાદ કેન્દ્ર**

672. ઉત્તર ભારતમાં ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-પૂર્વ તરફથી વાતા ગરમ અને સૂકા પવનને .... કહે છે. - **લૂ**

673. પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો ક્યો ક્રમ સાચો છે ? - **નાગાટેકરીઓ, જેન્તિયા, ખાસી, ગારો**

674. ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત ક્યા વર્ષે થઈ ? - **1993**

675. ચીન અનુસાર અરુણાચલ પ્રદેશ ક્યા વિસ્તારનો એક ભાગ છે? - **દક્ષિણ તિબેટ**

676. ક્યા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ (75) છે ? - **ઉત્તર પ્રદેશ**

677. ભારતમાં મેન્ગ્રોવ વન ક્ષેત્ર જે આવેલ છે, તે વિશ્વના મેન્ગ્રોવ ક્ષેત્રના કેટલા ટકા છે ? - **7**

678. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ.........ખાતે પ્રથમ શ્યોક પુલનું ઉદ્ઘાટન કર્યુ. - **લેહ**

679. તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે બે નવા સીમા પારના પોઈન્ટ ખુલ્લા મુક્યા ? - **બાંગ્લાદેશ અને મ્યાનમાર**

680. ભીલ, ડામોર, મીના, ઢાંકા ક્યા વિસ્તારમાં મળતી મુખ્ય આદિજાતિઓ છે ? - **રાજસ્થાન**

681. ક્યા રાજ્યએ 'નો હેલ્મેટ, નો પેટ્રોલ'ના નિયમ અમલમાં મૂક્યો ? - **આંધ્ર પ્રદેશ**

682. ભરતપુર ખાતેનું કેઓલેડેયો રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે પ્રખ્યાત છે ? - **પક્ષીઓ**

683. નીલગીરી પાસે કેટલી પર્વતશ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે ? - **ત્રણ**

684. દેવદારના વૃક્ષો સામાન્ય રીતે.......પ્રકારના જંગલોમાં જોવા મળે છે. - **હિમાલયના શંકુદ્રુમ જંગલ**

685. 'કારેવા નિક્ષેપણો'.........માં જોવા મળે છે. - **કાશ્મીર ખીણ**

686. ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે ? - **મધ્ય પ્રદેશ**

687. બોક્સાઈટ ભંડારમાં મહત્તમ અગ્રણી રાજ્ય....... છે. - **ઓરિસ્સા**

688. રાજ્યોનું ક્યું જૂથ કઠોળ પાક ઉત્પાદન માટે વિખ્યાત છે ? - **મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન**

689. ગંગા નદી સાથે ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે ? - **NW-1**

690. ક્યા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પુર આવે છે ? - **તમિલનાડુ**

691. અંદામાન-નિકોબારના ટાપુઓમાં ક્યા આદિવાસીઓની વસતી જોવા મળે છે ? - **જારવા**

692. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમસ્થાન ક્યા દેશમાં છે ? - **તીબેટ**

693. બસ્સો વર્ષ જૂની 'બામ્બુ ટપક પદ્ધતિ' ભારતના ક્યા રાજ્યમાં ઉપયોગમાં લેવાય છે ? - **મેઘાલય**

694. દેશનું પહેલુ મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યા શરૂ કરવામાં આવ્યું છે ? - **કોલકાતા**

695. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણે આંતરરાષ્ટ્રીય પરિયોજનાના ભાગરૂપે .... ત્રિપક્ષીય રાજમાર્ગ કરાર કર્યા છે. - **ભારત, મ્યાનમાર, થાઈલેન્ડ**

696. જમ્મુ-કાશ્મીરમાં ક્યા પ્રકારની માટી મળે છે ? - **પર્વતીય-વનીય**

697. 'વાઘ' અને 'સિંહ' બંનેનું પ્રાકૃતિક નિવાસ સ્થાન છે તેવા દેશનું નામ જણાવો. - **ભારત**

698. લાલ પાંડા ભારતમાં ક્યા જોવા મળે છે ? - **પૂર્વ હિમાલય**

699. રાષ્ટ્રીય જળમાર્ગ-2 કઈ નદી સાથે જોડાયેલો છે ? - **બ્રહ્મપુત્રા**

700. ભારતમાં કુલ કેટલા કિમી રસ્તાઓનું નેટવર્ક છે ? - **54.8 લાખ કિલોમીટર**

701. ભારતના ક્યા રાજ્યને 'ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે ? - **પંજાબ**

702. ભારતને હિન્દ મહાસાગરમાંથી કઈ ધાતુનું ખનન કરી મેળવવાનો અધિકાર મળ્યો છે ? - **મેંગેનીઝ**

703. જૈવભારમાંથી ક્યા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે ? - **ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ**

704. ક્યા રાજ્યમાં રૂફ ટોપ રેઈનવોટર હાર્વેસ્ટીંગ (વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા) ફરજિયાત કરવામાં આવી છે ? - **તમિલનાડુ**

705. લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે ? - **પરવાળા**

706. તુંગભદ્રા, માલપ્રભા તથા ઘાટપ્રભા કઈ નદીની સહાયક નદીઓ છે ? - **કૃષ્ણા**

707. અબરખ, ચૂનાનો પથ્થર, ફોસ્ફેટને કઈ ખનીજ તરીકે વર્ગીકૃત કરાયા છે ? - **બિનધાતુ ખનીજ**

708. ભારત-પાકિસ્તાનની જળ સમજુતી કઈ નદી પર થઈ છે ? - **સિંધુ**

709. ભૌગોલિક દૃષ્ટિએ ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય અન્ય કેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે ? - **5**

710. સેન્ટ્રલ લેપ્રસી ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે? - **ચેંગાલપટ્ટુ**

711. ભારતના ક્યા રાજ્યમાં સૌથી જૂના શૈલ સમૂહ છે ? - **કર્ણાટક**

712. ભારતમાં ક્યા શહેરમાં હાથશાળના કાપડનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે ? - **મદુરાઈ**

713. ભાનરતમાં દેશમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે ? - **414 રેડિયો સ્ટેશન અને 584 ટ્રાન્સમીટર્સ**

714. ભારતમાં સૌથી લાંબા અંતરની રેલવે ટ્રેન કઈ છે ? - **વિવેક એકસપ્રેસ દિબ્રુગઢ-કન્યાકુમારી**

715. લોખંડ, તાંબુ અને જસત ખનીજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? - **આગ્નેય ખડકો**

716. જમીનની પરિપક્વતા નક્કી કરવામાં ક્યું પરિબળ ભાગ ભજવે છે ? - **ખવાણ અને ધોવાણ**

717. ભારતમાં ક્યું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? - **બેંગલુરુ**

718. વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે ? - **રાજસ્થાન**

719. ભારતનું સૌથી મોટું જળ વિદ્યુતમથક ક્યાં રાજ્યમાં આવેલું છે ? - **તમિલનાડુ**

720. નદીઓના નવા કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે ? - **ખદર**

721. ક્યા જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ ભારતીય જંગલી ગધેડા છે? - **કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર**

722. આંદામાન અને નિકોબાર ટાપુ, કચ્છનો અખાત અને મન્નારનો અખાત .... રિફ ધરાવે છે. - **કોરલ**

723. કાવેરી દ્વીપકલ્પીય નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? - **સહ્યાદ્રી**

724. ભારતના રાજ્યોમાં ક્યું રાજ્ય ફુલ્લી ઓર્ગેનિક અને જૈવિક રાજ્ય તરીકે જાહેર થયેલ છે ? - **સિક્કિમ**

725. ભારતમાં 2011ની વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલા ટકા છે ? - **74.04%**

726. કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? - **કોંડાવીડુ ટેકરીઓ**

727. ભારતમાં ઈ.સ.1854માં સુતરાઉ કાપડની મિલ ક્યા શરૂ થઈ હતી ? - **મુંબઈ**

728. માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે ? - **અરવલ્લીની**

729. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે ? - ભોપાલ

730. સિંધુ નદી જમ્મુ-કાશ્મીરના ક્યા જિલ્લામાં પ્રવેશ કરે છે ? - લદ્દાખ

731. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? - ઓક્ટોબર-નવેમ્બર

732. ભારતમાં ક્યા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ? - ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો

733. ઉત્તર-પૂર્વ સીમાંત રેલવેનું વડુમથક ક્યું છે ? - માલીગાંવ-ગુવાહાટી

734. ભારતમાં આવેલો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યો ? - શિબપુર - પશ્ચિમ બંગાળ

735. મહત્ત્વની દ્વીપકલ્પીય તુંગભદ્રા નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? - સહ્યાદ્રી

736. નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત નર્મદા સેવા યાત્રાની સમાપ્તિના પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રયત્નને વ્યાપક રૂપ આપવા માટે એક મિશનની શરૂઆત કરેલ છે. તેનું નામ શું છે ? - નર્મદા સેવા મિશન

737. કંડલાને ક્યા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવેલ હતું ? - 1955

738. પહેલીવાર ભારતીય રેલવેએ કઈ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે ? - વિશાખાપટ્ટનમ-કિરાંદૂલ પેસેન્જર ટ્રેન

739. સુબણસિરિ, કામેંગ અને સંકોસ કઈ નદીની સહાયક નદીઓ છે ? - બ્રહ્મપુત્રા

740. જિમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલ છે ? - ઉત્તરાખંડ

741. ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી ? - હિમાલયન

742. ઉષ્ણ કટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે ? - વ્યાપારી પવનો

743. વુલર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે? : જમ્મુ-કાશ્મીર

744. સૌથી વધુ નહેરોનું પ્રમાણ ક્યા રાજ્યમાં છે ? : ઉત્તર પ્રદેશ

745. ક્યું રેલવે સ્ટેશન ભારતનું સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાયું ? - ગુવાહાટી

746. 'નાવિકા સાગર પરિક્રમા' શું છે ? - ભારતની નૌકાદળની તમામ મહિલા ટુકડીની પૃથ્વીની પ્રદક્ષિણા સફર

747. હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જાણીતું છે ? - કાળા રંગની

748. ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IARI) ક્યા આવેલું છે ? - નવી દિલ્હી

749. ....શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે આવેલી છે ? - ધરતી

750. પશ્ચિમી વિક્ષોભ જે ભારતમાં ઠંડીની ઋતુમાં કઈ બાજુથી પ્રવેશ કરે છે ? - પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ

751. નરોરા એટોમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં સ્થિત છે ? - ઉત્તર પ્રદેશ

752. ભારતનો ક્યો દરિયાકાંઠો ઉત્તરપૂર્વી ચોમાસાની વરસાદ મેળવે છે ? - કોરોમન્ડલ દરિયાકાંઠો

753. ભારતની દામોદર અને નર્મદા નદી ક્યા પ્રકારની ખીણમાંથી વહે છે ? - ફાટ ખીણ

754. રેલવે એન્જિનનું નિર્માણ પશ્ચિમ બંગાળમાં ક્યા થાય છે ? - ચિતરંજન

755. દેશના ક્યા વિમાની મથક ઉપર પ્રવાસીઓની સૌથી વધુ અવર-જવર રહેલી છે ? - ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ

756. સૌપ્રથમ ભારતમાં વસતી ગણતરી ક્યા વર્ષે હાથ ધરાઈ હતી ? - ઈ.સ.1872

757. ભારતમાં...... અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહ તરીકે ઓળખ આપવામાં આવી છે. - 75

758. ભારતમાં અનાનસનું સૌથી વધુ ઉત્પાદન ક્યું રાજ્ય કરે છે ? - પશ્ચિમ બંગાળ

759. ભારતના વન્યજીવનના રાષ્ટ્રીય બોર્ડના મુખ્ય કોણ હોય છે? - પ્રધાનમંત્રી

760. ન્હાવાશેવા (જવાહરલાલ નહેરુ પોર્ટ) ક્યા રાજ્યમાં આવેલું છે? - મહારાષ્ટ્ર

761. ઉપનદી હેમવતી કઈ મુખ્ય નદીને મળે છે ? - કાવેરી

762. વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી ક્યા સ્થળે આવેલ છે ? - દહેરાદૂન

763. સલીમ અલી પક્ષી વિહાર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલ છે? - ગોવા

764. ઈન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલી છે ? - નર્મદા

765. ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ ક્યા નામે ઓળખાય છે ? - બાંગર

766. ઝેલમ, ચિનાબ અને રાવી કઈ નદી તંત્રનો ભાગ છે ? - સિંધુ પ્રવાહ પ્રણાલી

767. લોકતક સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે ? - મણિપુર

768. આંતરિક જળમાર્ગોના વિકાસ માટે ક્યા વર્ષમાં ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળની રચના કરવામાં આવી હતી ? - ઈ.સ.1986

769. તાનસા અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે ? - મહારાષ્ટ્ર

770. ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર ક્યું છે ? - કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર

771. ભારતમાં કેટલા ટકા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે ? - 93

772. લોનાર સરોવર ક્યા સરોવરનું દૃષ્ટાંત છે ? - જ્વાળામુખી સરોવર

773. મેકમોહન અંકુશ રેખા ક્યા દેશોની અલગ કરે છે ? - ભારત-ચીન

વસતી

GPSC Class - 2 - 16/04/2017

1. સને 2013 નાં આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યનો IMR (Infant Mortality rate, Per 1000 Live Birth) કેટલો છે.
A)40 B)38 C)36 D)34

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

2. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતાં દર કેટલા ટકા છે ?
A)75% B)79.31% C)76% D)80%
3. ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે?
A)સિક્કિમ B)મણીપુર
C)અરૂણાચલપ્રદેશ D)નાગાલેન્ડ

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

4. રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ?
A)949 અને 880 B)943 અને 919
C)949 અને 919 D)943 અને 880
5. ગુજરાત રાજ્યમાં જાતિપ્રમાણ : દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા કેટલી છે ?
A)900 B)915 C)916 D)918
6. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા જિલ્લામાં છે ?
A)દાહોદ B)ડાંગ C)સુરત D)નર્મદા
7. ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ?
A)કચ્છ જિલ્લો B)ડાંગ જિલ્લો
C)સુરત જિલ્લો D)નર્મદા જિલ્લો
8. ગુજરાત રાજ્યની કુલ વસતીમાં ગ્રામીણ વસતી કેટલા ટકા છે?
A)42.6 ટકા B)57.4 ટકા C)50.00 ટકા D)40.00 ટકા
9. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?
A)સાબરકાંઠા B)પંચમહાલ C)ડાંગ D)નર્મદા
10. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓ કેટલી છે ?
A)10 B)12 C)15 D)17
11. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિચરતી જાતિઓ કેટલી છે ?
A)12 B)15 C)25 D)28
12. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી આદિવાસી જાતિઓ છે ?
A)30 B)25 C)13 D)29
13. ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી (2011ની વસતી ગણતરી પ્રમાણે) ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા છે ?
A)11 ટકા B)6.2 ટકા C)7.1 ટકા D)14.15 ટકા
14. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસતી આવેલ છે ? (2011ની વસ્તી ગણતરી પ્રમાણે)
A)બનાસકાંઠા B)અમદાવાદ C)રાજકોટ D)કચ્છ
15. ગુજરાત રાજ્યમાં 2011ની વસતી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની વસતી ગુજરાતની કુલ વસતીના કેટલા ટકા છે ?
A)14.8 ટકા B)12.2 ટકા C)8.8 ટકા D)20.12 ટકા
16. નીચેનામાંથી કઈ જાતિ આદિવાસીઓમાં અતિ પછાત એવી આદિમજાતિ નથી ?
A)કોટવાળીયા B)કથોડી C)ચૌધરી D)પઢાર
17. ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસતી ગણતરી મુજબ કેટલો છે ?
A)65 અને 68 B)79 અને 74 C)73 અને 78 D)68 અને 65

GPSC Class - 2 - 5/3/2017

18. સને 2011નાં આંકડાઓ મુજબ ગુજરાતની વસ્તી ગીચતા (Density of population) કેટલી છે ?
A)382 B)308 C)573 D)353
19. ગુજરાતમાં કયા જિલ્લામાં ગ્રામ્યક્ષેત્રમાં સેક્સ રેસીયો (Sex Ratio - No. of females per 1000 males) સૌથી વધારે છે?
A)અમરેલી B)ડાંગ C)નવસારી D)તાપી
20. ગુજરાતમાં કુલ વસ્તીનાં કેટલા ટકા વસ્તી યુવાનો (15 થી 24 વર્ષનું વય જૂથ)ની છે ? (Youth population)
A)18.27 B)18.77 C)19.27 D)19.77
21. સને 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વસ્તી કયા વય જૂથમાં (Age groupwise population) છે?
A)25 થી 34 B)35 થી 59 C)15 થી 24 D)7 થી 14

1)C, 2)B, 3)A, 4)C, 5)D, 6)C, 7)A, 8)B, 9)C, 10)B, 11)D, 12)B, 13)C, 14)B, 15)A, 16)C, 17)B, 18)B, 19)D, 20)C, 21)B.

વિશ્વની ભૂગોળ

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

1. સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ?
A)ત્રાંસી B)સીધી C) લંબગોળાકાર D) ગોળાકાર

GPSC પેપર - 2 - 2017

2. પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ?
A)2.7 ગ્રામ / સે.મી.^{3} B) 3.0 ગ્રામ / સે.મી.^{3}
C)5.5 ગ્રામ / સે.મી.^{3} D) 16.0 ગ્રામ / સે.મી.^{3}

3. સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ?
A) મેગ્નેશિયમ ક્લોરાઈડ B) મેગ્નેશિયમ સલ્ફેટ
C) કેલ્શિયમ સલ્ફેટ D) પોટેશિયમ સલ્ફેટ

4. વિષુવવૃત્ત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ?
A)5 કિ.મી. B) 16 કિ.મી. C) 20 કિ.મી. D) 50 કિ.મી.

5. વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંસ વચ્ચે આવેલાં છે?
A)0° - 5° B)5° - 15° C) 15° - 30° D) 30° - 50°

6. કર્કવૃત્ત અને મકરવૃત્ત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે?
A) પરિભ્રમણ B) કક્ષાભ્રમણ
C) પૃથ્વીનું અક્ષીય નમન D) અક્ષીય નમન પૂર્વનું કક્ષાભ્રમણ

7. બ્રાઝીલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ?
A) ઉષ્ણકટિબંધીય જંગલો B) સમશીતોષ્ણ જંગલો
C) ચોમાસુ જંગલો D) શંકુદ્રુમ જંગલો

8. નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ?
A) કેનરી B) અખાતી પ્રવાહ C) લાબ્રાડોર
D) કુરિલ

GPSC MAINS પેપર - 2 - 2016

9. રશિયા અને યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાને જોડતી સામુદ્રધુનીનું નામ આપો.
A) બેરીંગ સામુદ્રધુની B) જીબ્રાલ્ટર સામુદ્રધુની
C) ડોવર સામુદ્રધુની D) મેસીના સામુદ્રધુની

10. કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ?
A) ટર્શરી (Tertiary) B) જુરાસિક (Jurassic)
C) પ્લિસ્ટોસીન (Pleistocene) D) ક્રિટેસસ (Cretaceous)

11. ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે ?
A) સ્તરભંગ B) ગેડીકરણ
C) જ્વાળામુખીય D) ઉપરના પૈકી કોઈ નહી

PSI GK - 1/1/2017

12. ક્ષેત્રફળની દૃષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ?
A) આફ્રિકા B) યુરોપ
C) ઉત્તર અમેરિકા D) દક્ષિણ અમેરિકા

13. નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ?
A) ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન
B) ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન
C) ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન
D) ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન

14. બોસ્નિયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ?
A) ત્રિપોલી B) બ્બાન્યા લુકા C) સારાજેવો D) દુબ્રોવેનિક

PSI GK - 4-3/5-3/2017

15. પૃથ્વીનો અંદાજીત પરિઘ કેટલી છે ?
A) 25,000 કિમી B) 16,000 કિમી
C) 40,000 કિમી D) 50,000 કિમી

16. વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ?
A) નંગા પર્વત B) નંદા દેવી
C) એન્ડીસ D) ગોડવીન ઓસ્ટીન

17. પૃથ્વીની ફરવાની દિશા .... છે.
A) પશ્ચિમ થી પૂર્વ B) પૂર્વ થી પશ્ચિમ
C) ઉત્તર થી દક્ષિણ D) દક્ષિણ થી ઉત્તર

18. ભૂમધ્ય રેખા, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ?
A) ઓસ્ટ્રેલિયા B) ઉત્તર અમેરિકા
C) દક્ષિણ અમેરિકા D) આફ્રિકા

બિન સચિવાલય કલાર્ક - 2016

19. સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ?
A) સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય
B) પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
C) પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય
D) (A), (B) અને (C) ત્રણેય સ્થિતિમાં

1)C, 2)C, 3)A, 4)B, 5)C, 6)D, 7)A, 8)B, 9)A, 10)C, 11)C, 12)A, 13)A, 14)C, 15)C, 16)D, 17)A, 18)D, 19)B.

GPSC પ્રિલિમ - 2007

20. બર્માનું નવું નામ શું છે ?
A)કામ્પુચિયા B)મ્યાનમાર C)લાઓસ D)અક્યાબ

GPSC પ્રિલિમ - 2014

21. સૂર્ય - ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?
A)ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે.
B)ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે.
C)ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે.
D)ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે.

22. યુક્રેનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ - 2014માં જોડાયો?
A)પશ્ચિમ યુક્રેન ડિવિઝન B)ઉઝબેકિસ્તાન
C)કઝાકિસ્તાન D)ક્રીમિયા

23. કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ?
A)14મી જાન્યુઆરી B)28મી જાન્યુઆરી
C)22મી ડિસેમ્બર D)30મી ડિસેમ્બર

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

24. પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે?
A)3 (ત્રણ) B)4 (ચાર) C)5 (પાંચ) D)6 (છ)

25. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
A)નાઈલ B)યાંગત્સે C)મિસિસિપી D)એમેઝોન

26. પૃથ્વીને સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે?
A)સમતાપાવરણ B)આયનોવરણ
C)મધ્યાવરણ D)ક્ષોભાવરણ

27. ધનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?
A)8 થી 16% B)29% C)36 થી 42% D)71 %

28. ગ્રીનીચ કયા દેશમાં આવેલું છે?
A)ભારત B)ઈંગ્લેંડ C)રશિયા D)યુ.એસ.એ

29. સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે?
A)કર્ક વૃત્ત B)મકર વૃત્ત C)ધ્રુવ વૃત્ત D)વિષવ વૃત્ત

30. રાત્રી દરમ્યાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય છે?
A)જમીનની લહેરો B)પાણીની લહેરો
C)દરિયાઈ લહેરો D)મોસમી લહેરો

PSI/ASI GK - 2/5/2015

31. કયો મહાસાગર સૌથી વિશાળ છે ?
A)હિંદ મહાસાગર B)અરબ મહાસાગર
C)પ્રશાંત મહાસાગર D)એટલાન્ટીક મહાસાગર

32. વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ?
A)દક્ષિણ અમેરિકા B)દક્ષિણ આફ્રિકા
C)એશિયા D)ઓસ્ટ્રેલિયા

33. દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યા પ્રદેશમાં પડે છે ?
A)ભારત B)લીબીયા C)દુબઈ D)ઈરાન

34. એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ?
A)ગંગા B)યાંગત્સે C)ઈરાવતી D)બ્રહ્મપુત્રા

35. બ્રહ્મદેશનું હાલનું નામ શું છે ?
A)થાઈલેન્ડ B)મ્યાનમાર C)સિક્કીમ D)માલદીવ

36. પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ?
A)જ્વાળામુખી B)બરફ
C)વરસાદ D)ભૂકંપ

37. જાપાનનું બીજુ નામ શું છે ?
A)ફોરમોસા B)ઘાના C)બર્મા D)નિપોન

38. વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ?
A)અમેરિકા B)યુરોપ C)એશિયા D)ઓસ્ટ્રેલિયા

39. વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ?
A)મલેશિયા B)ભારત C)શ્રીલંકા D)બ્રાઝીલ

GPSC Class-1 - 2016

40. દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો-હવાનું તોફાન ક્યા દેશમાં થાય છે?
A)યુ.એસ.એ. B)ચીન
C)જાપાન D)ભારત

41. કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ?
A)એલ્યુશિયન પ્રવાહ B)લેબ્રેડોર પ્રવાહ
C)મોઝામ્બીક પ્રવાહ D)એગુલ્હાસ પ્રવાહ

42. દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે ?
A)પેસિફિક મહાસાગર B)આર્કટિક મહાસાગર
C)એટલાંટિક મહાસાગર D)હિંદી મહાસાગર

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

43. નીચેના પૈકી કયાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે?
A)Sao Paulo B) Santos
C)Rio-de-Jeneiro D) Buenos Aires

20)B, 21)D, 22)D, 23)C, 24)A, 25)A, 26)D, 27)B, 28)B, 29)D, 30)A, 31)C, 32)A, 33)B, 34)B, 35)B, 36)A, 37)D, 38)C, 39)A, 40)A, 41)B, 42)A, 43)B.

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

44. નીચેના પૈકી ક્યા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે?
A) યુ.એસ.એ. B) કેનેડા
C) ભારત D) ઓસ્ટ્રેલિયા

45. રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે?
A) ભારત અને પાકિસ્તાન B) ભારત અને ચીન
C) ભારત અને મ્યાનમાર D) ભારત અને અફઘાનિસ્તાન

46. જિબ્રાલ્ટરની સામુદ્રધુની ક્યા બે જળક્ષેત્રોને જોડે છે?
A) અરબ સાગર અને બંગાળનો ઉપસાગર.
B) ભૂમધ્ય સમુદ્ર અને એટલેન્ટિક મહાસાગર
C) ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર
D) એટલેન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર

47. યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે?
A) શિકાગો B) ડેટ્રોઈટ C) ન્યૂયોર્ક D) ન્યૂજર્સી

48. ક્યો દેશ સહકારી ડેરીના દેશ ગણાય છે?
A) ડેન્માર્ક B) જર્મની C) જાપાન D) ચીન

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

49. નીચેના પૈકી કયું "યુનાઈટેડ કિંગ્ડમ"નો ભાગ નથી?
A) સ્કોટલેન્ડ B) ફિનલેન્ડ C) આયર્લેન્ડ D) બ્રિટન

50. દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર ક્યા બે સમુદ્રોને જોડે છે?
A) ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર
B) રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર
C) કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર
D) જાપાની સમુદ્ર અને દક્ષિણચીની સમુદ્ર

51. દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ "ટ્રાન્સસાઈબીરીયન લાઈન" ક્યા દેશમાં આવેલો છે?
A) ચીન B) અમેરીકા C) કેનેડા D) રશિયા

GPSC Class-1 - 15/01/2017

52. આપણાં દેશના જેમ ભારત તથા India તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી ક્યા દેશનું બીજું નામ ખોટું છે?
A) વેટિકન - હોલી સી B) જાપાન - નિપોન
C) તાઈવાન - સુઓમી D) નેધરલેન્ડ - હોલેન્ડ

53. TAPI કહેવાતી પાઈપલાઈનના પ્રોજેક્ટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે?
A) 2 B) 3 C) 4 D) 5
(અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડિયાને)

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

54. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય .... અવસ્થામાં હોય છે.
A) ઘન B) પ્રવાહી C) વાયુ D) પ્લાઝમા

55. કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે ?
A) હાંગો B) મિસસિપિ C) હોઆંગહો D) સુઆંગહો

56. ક્યા પ્રકારની વર્ષામાં નીચે પડતા બરફકણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે ?
A) સ્લીટ વર્ષા B) કરા વર્ષા
C) બરફ વર્ષા D) સાયક્લોનીક રેન

57. દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યા આવેલી છે ?
A) ફિલિપાઈન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાના ખાઈ
B) પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ
C) એટલાંટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ
D) હિંદ મહાસાગરની જાવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ'

58. યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાંડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ?
A) એમેઝોન B) મિસિસિપી-મિસૌરી
C) કોંગો D) કોલોરાડો

59. સમુદ્રમાં તળીયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂંકપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાં ને શું કહે છે ?
A) કંપન મોજાં B) પ્રેલન મોજાં
C) સ્થાનાંતરિય મોજાં D) સુનામિ મોજાં

60. નીચેના પૈકી ક્યા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ?
A) જમશેદપુર B) બેંગકોક C) જેસલમેર D) કરાંચી

61. સૌથી વધુ સમય પટ્ટા (ટાઈમ ઝોન) ક્યા દેશમાં છે ?
A) યુ.એસ.એ. B) કેનેડા C) ભારત D) ચીન

GPSC Class - 2 - 16/04/2017

62. બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે?
A) સીયાન B) થેમ્સ C) હડસન D) ટાઈગ્રીસ.

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

63. ગ્રિનિચ નામનું સ્થળ ક્યા દેશમાં આવેલું છે?
A) ભારત B) રશિયા C) યુ.એસ.એ. D) ઈંગ્લેન્ડ

64. નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે?
A) જાપાન B) મલેશિયા C) નેપાળ D) રશિયા

44)B, 45)A, 46)B, 47)B, 48)A, 49)B, 50)A, 51)D, 52)C, 53)B, 54)D, 55)C, 56)A, 57)A, 58)D, 59)D, 60)B, 61)B, 62)D, 63)D, 64)B.

GPSC Class - 2 - 18/03/2017

65. નીચેના કયા દેશોના સમુહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે?
A)બ્રાઝિલ, ઝાંબીયા B)કોલંબીયા, કેન્યા
C)બ્રાઝિલ, સુદાન D)ઈથોપિયા, ઈન્ડોનેશીયા

66. નીચેના કયા દેશની સીમા ઉપર "મેડીટેરીનીયન સી" આવેલ નથી?
A)સીરીયા B)જોર્ડન C)લેબેનોન D)ઈઝરાયેલ

GPSC Class - 1 - 28/01/2017

67. નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી?
A)કમ્બોડિયા - કમ્પુચિયા B)ઝાંઝીબાર - તાન્ઝાનિયા
C)રહોડેશિયા - તાન્ઝાનિયા D)પર્શિયા - ઈરાન

68. ફીઝી ટાપુ કોનો ભાગ છે?
A)ઈન્ડોનેશીયા B)મલેશિયા
C)પોલિનેશીયા D)ઉપર પૈકી એક પણ નહી

69. નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી?
A)ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ
B)સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેન્ડ
C)લવિંગનો ટાપુ - ઝાંઝીબાર
D)હિન્દ મહાસાગરનું મોતી - શ્રીલંકા

70. વિસ્તાર અને વસ્તીની દ્દષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે?
A)નેપાળ B)સેન્ટ કિટસ નેવીસ
C)વેટીકન સીટી D)પેરૂ

71. સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું?
A)ઈ.સ.1956 B)ઈ.સ.1962 C)ઈ.સ.1956 D)ઈ.સ.1963

GPSC Class - 2 - 16/04/2017

72. ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે?
A)ભારત અને પાકિસ્તાન B)ભારત અને ચીન
C)ભારત અને મ્યાનમાર D)ભારત અને અફઘાનિસ્તાન

GPSC Class - 2 - 18/03/2017

73. નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી કયું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી?
A)સેબલ B)રેકુન C)હેરિંગ D)કેરિબુ

74. નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્દષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે?
A)તુવાલુ B)રીપબ્લિકન ઓફ માલદીવ
C)મોનાકો D)વેટીકન

75. એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે?
A)પેસિફિક મહાસાગર B)હિંદી મહાસાગર
C)આફ્રિકાખંડ D)ભૂમધ્ય સમુદ્ર

76. વોશિંગ્ટન કયા નદીના કિનારે વસેલ છે?
A)આસ્નોલા B)મિસિસિપી C)લેવીસ D)પોટોમેક

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

77. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપીયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા?
A)30 B)22 C)28 D)26

GPSC Class - 2 - 11/12/2016

78. નાઈલ નદી બાબતે કયું વિધાન સાચું નથી?
A)તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે.
B)એલેકઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે.
C)કૈરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે
D)અમેરિકાની મહત્ત્વની નદી છે

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

79. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે?
A)6,203 B)6,378 C)6,491 D)6,193

80. માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચુ શિખર છે?
A)ઈંગ્લેન્ડ B)ફ્રાન્સ C)જર્મની D)રશિયા

81. ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે?
A)બ્રાઝિલ B)ઓસ્ટ્રેલિયા C)જાપાન D)ચીન

82. પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે?
A)1670 B)1706 C)1607 D)1760

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

83. સુએઝ નહેર કોન જોડવા માટે બનાવવામાં આવી હતી?
A)ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર
B)પેસિફિક અને હિંદ મહાસાગર
C)એટલેન્ટિક અને પેસિફિક
D)એકેય નહીં

65)B, 66)B, 67)C, 68)C, 69)A, 70)C, 71)A, 72)A, 73)C, 74)D, 75)A, 76)D, 77)C, 78)D, 79)B, 80)B, 81)A, 82)A, 83)A.

TET-II -2017

84. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત પર કલાકના કેટલા કિમીની ઝડપે ફરે છે ? - 1670
85. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર વાસ્કો-દ-ગામાને ક્યા હિન્દી ખલાસીની મદદ મળી હતી ? - **મહમદ-ઈબ્ન-મજીદ**
86. વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. - **NATMO (નેશનલ એટલાસ થિમેટિક મેપ ઓર્ગેનાઈઝેશન)**
87. તમારુ ઘર પૃથ્વીના ક્યા આવરણ ઉપર બાંધવામાં આવેલું છે ? - **મૃદાવરણ**
88. કાલગુર્લી અને કુલગાર્ડી શું છે ? - **સોનાની ખાણ**
89. 0^0 રેખાંશવૃત ક્યા દેશમાંથી પસાર થાય છે ? - ઈંગ્લેન્ડ
90. કર્કવૃત કે મકરવૃત્ત પસાર ન થતું હોય તેવો ખંડ ક્યો છે ? - **યુરોપ**
91. ભારતનો ક્યો પાડોશી દેશ ISLAND OF JEMS (રત્નદીપ) અથવા પૂર્વના મોતી તરીકે ઓળખાય છે ? - **શ્રીલંકા**
92. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે ? - **પશ્ચિમથી પૂર્વ**
93. ટેક્સાસ રાજ્યમાં ફૂંકાતા અતિશય ગતિ વેગવાળા ચક્રવાતોને ક્યા નામે ઓળખવામાં આવે છે ? - **ટોર્નેડો**
94. કદમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી એમેઝોન નદી ક્યા ખંડમાં આવેલી છે ? - **દક્ષિણ અમેરિકા**
95. બે રેખાંશવૃત્તો વચ્ચેનું અંતર ફક્ત..........ઉપર આશરે 111 કિમીનું હોય છે ? - **વિષુવવૃત**
96. વાયવ્ય ચીનના પીળી માટીના મેદાનો ક્યા નામથી ઓળખાય છે ? - **લોએસ**
97. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું સરોવર ક્યું છે ? - **ટિટિકાકા**
98. સૌથી વધુ લાંબા દરિયા કિનારાવાળો દેશ ક્યો છે ? - **કેનેડા**

HPAT -2015

99. આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત ક્યો છે ? : **કિલિમાન્જારો**

HPAT - 2014

100. વિશ્વનો એવો ક્યો ખંડ છે જ્યાથી કર્કવૃત્ત, વિષુવવૃત અને મકરવૃત્ત પસાર થાય છે? : **આફ્રિકા**

પોલીસ કૉન્સ્ટેબલ - 2012

101. ગ્રીનીચ સમય રેખા ક્યા શહેરમાંથી પસાર થાય છે? - **લંડન**
102. સૂર્યગ્રહણ વિશે શું સાચું છે ? - **તે અમાસને દિવસે થાય છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે**
103. યાત્રા સ્થળ કૈલાશ માનસરોવર ક્યાં આવેલું છે? - **ચીન**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

104. દુનિયાનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ? - **8,848 મીટર**
105. પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? - **71**
106. ક્યા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? - **21 જૂન**
107. ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ? - **સીન**
108. સૂર્યનો વ્યાસ કેટલા કિ.મી.નો છે ? - **13,92,000**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

109. ગોન્ડવાના લેન્ડ એટલે શું ? - **આદિ મહાખંડનો દક્ષિણી ભાગ**
110. કોલસામાંથી ક્યો રૂપાંતરિત ખડક તૈયાર થાય છે ? - **ગ્રેફાઈટ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

111. યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
કર્કવૃત્ત : વિષુવવૃતથી ઉત્તર તરફની આડી રેખા, મકરવૃત : વિષુવવૃતથી દક્ષિણ તરફની આડી રેખા, વિષુવવૃત : પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી આડી રેખા
112. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડીત ખડક-પદાર્થોમાના નાના પત્થરો ક્યા નામે ઓળખાય છે? - **લાપિલી**

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર ક્લાર્ક - 2012

113. બ્રાઝિલ વિશ્વના ક્યા ખંડમાં આવેલ છે? - **દક્ષિણ અમેરિકા ખંડ**

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

114. ઈક્વિનોક્સ દિવસ અને રાત સરખા રહેવાની ઘટના ક્યાં દિવસ બને છે ? - **21 માર્ચ - 23 સપ્ટેમ્બર**

TAT - 2012

115. જમીનના ક્ષેત્રફળ પ્રમાણે ક્યો દેશ સૌથી મોટો છે? - **રશિયા**
116. કઈ પર્વતમાળા સૌથી લાંબી છે? - **એન્ડીઝ**

PSI - 2012

117. એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર કઈ ખાડી છે ? - **બેરીંગ ખાડી**

એકાઉન્ટ ઓફિસર - 1999

118. ઈજિપ્તની કઈ નદીને જીવાદોરી સમાન ગણાય ? - **નાઈલ**
119. ઈરાવતી નદી ક્યા દેશમાં આવેલી છે ? - **મ્યાનમાર**
120. વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારેમાસ કેવા પડે ? - **સીધા**
121. ચક્રવાત વંટોળને વેસ્ટ ઈન્ડિઝમાં શું કહેવાય ? - **હરિકેન**
122. તિબેટનું મુખ્ય શહેર ક્યું છે ? - **લ્હાસા**

123. સુમેરિઆમાં ઊંચી ટેકરી પર બાંધેલા ઊંચા મિનારાવા મંદિરને કહેવાય ? - ઝિગુરાત
124. અજાયબી જેવા પીરામીડો ક્યા દેશમાં છે ? - ઈજિપ્ત
125. વોલ્ગા નદી ક્યા દેશમાં છે ? - રશિયા
126. કેથોલિક સંપ્રદાયના વડા પોપનું નિવાસસ્થાન ક્યા છે ? - વેટિકન
127. સુએઝની નહેર ક્યા દેશની માલિકીની છે ? - ઈજિપ્ત

ચીફ ઓફિસર - 1999

128. પ્રાચીન ભારતમાં કોને સુવર્ણદ્વીપ કહેવામાં આવતો ? - ઈન્ડોનેશિયા

વૈદકિય સેવા - 2000

129. વિશ્વનો સૌથી નાનો ભૂમિખંડ ક્યો છે ? - ઓસ્ટ્રેલિયા
130. વિષુવવૃત્ત ક્યા ખંડની વચ્ચેથી પસાર થાય છે ? - આફ્રિકા

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

131. વિશ્વનો સૌથી મોટો અખાત ક્યો છે ? : મેક્સિકોનો અખાત
132. અંધારિયો ખંડ કહેવાય ? : આફ્રિકા
133. હજારો સરોવરોની ભૂમિ કહેવાય ? : ફિનલેન્ડ
134. પૃથ્વીનો સુરક્ષા વાલ્વ કોને કહેવાય ? : જ્વાળામુખી
135. પમ્પાસ નામક ઘાસ ક્યા થાય છે? : દક્ષિણ અમેરિકા
136. પશુપતિનાથ મંદિર ક્યા આવેલું છે ? : નેપાળ
137. ક્યાં દેશમાં સફેદ વાઘ જોવા મળે છે ? : બાંગ્લાદેશ
138. વિસ્તારની સરખામણીએ સૌથી મોટો દેશ ક્યો છે ? - રશિયા
139. પોપનું શહેર કોને કહેવાય ? - રોમ
140. શ્રીલંકાનું પ્રાચીન નામ જણાવો. - સિલોન
141. રંગૂન કઈ નદીના કિનારે વસેલું છે ? - ઈરાવદી
142. ગોરખા જાતિ ક્યા જોવા મળે ? - નેપાળ
143. રશિયાના સ્વાતંત્ર્ય સેનાની તરીકે ઓળખાય છે. - લેનિન
144. ક્યું શહેર ઈમારતી લાકડા માટે ઓળખાય છે ? - ઓટાવા
145. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે ? - પનામા નહેર
146. બેલ્જિયમમાં આવેલું વોટર લુ શું છે ? - યુદ્ધ સ્થળ
147. પ્રથમ ઓલિમ્પિક રમતનું આયોજન થયું હતું - એથેન્સ
148. GMT (ગ્રીનવિચ મેરિડિયન ટાઈમ) ક્યા શહેર નજીકથી પસાર થાય છે ? - લંડન
149. ઈન્ડોનેશિયાની રાજધાની કઈ છે ? - જાકાર્તા
150. સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યું છે ? - કેસ્પિયન
151. નાઈલનું ઉદ્ભવસ્થાન મનાય - વિક્ટોરિયા સરોવર
152. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર એટલે - સુપીરિયર
153. સિંધુ નદી ક્યાંથી ઉદ્ભવે છે ? - માનસરોવર
154. રાતા સાગરને ભૂમધ્ય સાગર સાથે કઈ નહેર જોડે છે ? - સુએજ નહેર
155. થારનું રણ ક્યા દેશોમાં પથરાયેલું છે ? - ભારત-પાકિસ્તાન
156. શિતોષ્ણ પ્રેયરી ઘાસ ક્યા ખંડમાં જોવા મળે છે ? - ઉત્તર અમેરિકા
157. સાઓ પાઉલો ક્યા આવેલ છે ? - બ્રાઝિલ
158. એન્ટાર્કટિકા પહોંચનાર પ્રથમ ભારતીય કોણ હતા ? - ડૉ.જી.એસ. સિરોહી
159. કેનેડાનું મોન્ટ્રિયલ ઉત્પાદન માટે જાણીતું છે - કાગળના
160. ગોલ્ડ કોસ્ટ તરીકે ઓળખાતો પ્રદેશ ક્યો છે ? - ઘાના
161. ખનિજ તત્ત્વોનું પરોક્ષ શોષણ ક્યા પ્રકારે થાય છે ? - પ્રસરણ અને આયનોની ફેરબદલી
162. ભૂગોળવિદ ટોલેમી ક્યા દેશ સાથે સંબંધિત છે ? - ગ્રીસ
163. સૂર્ય સ્વયં પ્રકાશિત મધ્યમ કદનો ...... છે. - તારો
164. વસ્તીના આશરે કેટલા ટકા ઉત્તર ગોળાર્ધમાં રહે છે ? - 90 %
165. પૃથ્વી પરના હવાના આવરણને શું કહેવાય છે ? - વાતાવરણ
166. ઓમાનના અખાત પર દક્ષિણ પૂર્વી ઈરાનમાં ક્યું બંદર સ્થિત છે? - ચાબહાર
167. ખનિજ તત્ત્વ શબ્દ ક્યા વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો ? - આર્નોન અને શાઉટ
168. ભૂટાનની રાજધાનીનું નામ જણાવો. - થિમ્ફુ
169. વિઘટિત થયા વિના આકાર અથવા બંધારણમાં પરિવર્તન પામેલા ખડકોને શું કહે છે ? - વિકૃત ખડકો
170. ભૂગોળવિદ સ્ટ્રેબો ક્યા દેશ સાથે સંકળાયેલ છે ? - રોમ (ઈટાલી)
171. સૂર્યમાં ઉત્પન્ન થતી ઊર્જા ક્યા સ્વરૂપે પ્રસરે છે ? - વિકિરણ સ્વરૂપે
172. શંકુદ્રુમ જંગલોમાં જોવા મળતા ઘાસને કહેવાય. - તાઈગા
173. પૃથ્વી પરનું જીવસૃષ્ટિને સાંકળે તે આવરણને શું કહેવાય ? - જીવાવરણ
174. બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બીગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે ? - ઈ. જ્યોર્જ લેમેત્ર દ્વારા
175. વાતાવરણનું ક્યું આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પુનરાવર્તીત કરે છે ? - આયન મંડળ
176. પૃથ્વીનો 'દક્ષિણ ધ્રુવ' ક્યા નામે ઓળખાય છે ? - એન્ટાર્કટિકા
177. દક્ષિણ અમેરિકામાં જોવા મળતું 'લામા' નામનું પ્રાણી ક્યા વર્ગનું પાલતું પ્રાણી છે ? - ઊંટ વર્ગનું

178. ક્યા દેશે વિશ્વનો પહેલો તરતો ન્યુક્લિયર પાવરપ્લાન્ટ બનાવ્યો છે ? - **રશિયા**

179. ભૂગોળવિદ આર્યભટ્ટને ક્યા દેશ સાથે સંબંધ છે ? - **ભારત**

180. સૂર્યની સપાટી પર શું દેખાય છે ? - **કાળા ધાબા કે સૂર્ય કલંક**

181. પૃથ્વી પર પાણીના વિશાળ જથ્થાના આવરણને શું કહેવાય છે ? - **જલાવરણ**

182. ભૂગર્ભમાં બનેલો મેગ્મારસ ભૂગર્ભ અને પૃથ્વીની સપાટી વચ્ચે આવેલી તિરાડોમાં ઠરી જવાથી રચાયેલા ખડકો ....છે. - **મધ્યસ્થિત ખડકો**

183. અગ્નિકૃત ખડકોને કઈ બાબત સાથે સંબંધ છે ? - **બેસાલ્ટ**

184. ક્યું સમુદ્રના પ્રવાહોના ઉદભવનું કારણ નથી ? - **સમુદ્રના જળપાત્રોની સપાટીનું રૂપ રેખાંકન**

185. બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે ? - **થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા**

186. ક્રાયોલાઈટ નામનું ખનિજ વિશ્વમાં માત્ર ....માં મળી આવે છે. - **ગ્રીનલેન્ડ**

187. વિશ્વમાં વિપુલ પ્રમાણમાં ક્યુ ખનીજ છે ? - **બ્રીજમેનાઈટ**

188. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ? - **13.5**

189. સામાન્ય રીતે ક્યા ખંડમાંથી મહત્તમ સંખ્યામાં કુદરતી આપત્તિઓના અહેવાલ મળે છે ? - **એશિયા**

190. ભૂગોળવિધ ઈબ્નબતુતાને ક્યા વિસ્તાર સાથે સંબંધ છે ? - **અરબસ્તાન**

191. ઈજીપ્તમાં કઈ ભૌગોલિક ક્રિયા દ્વારા રણની ખડક સપાટી પર પવનગર્ત રચાયા છે ? - **ઊંડાણ ક્રિયા**

192. પૃથ્વી પર માટીના સ્તર અને ખડકોનું જે આવરણ જોવા મળે છે તેને શું કહેવાય ? - **મૃદાવરણ**

193. બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે ? - **એલન સન્ડેસ દ્વારા**

194. સમશિતોષ્ણ ઘાસના મેદાનો કેટલે ? - **પ્રેઈરિઝ**

195. પ્રસ્તર ખડકોને કઈ બાબત સાથે સંબંધ છે ? - **શેલ**

196. હિમાલય ક્યા પાંચ દેશોમાંથી પસાર થાય છે ? - **ભુતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન**

197. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય ? - **સવાના**

198. સૂર્ય સામેથી એક રેખાંશવૃત્તને પસાર થતાં કેટલો સમય લાગે છે ? : **4 મિનિટ**

199. વિષુવવૃત્તીય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય: - **સેલ્વા**

200. સૂર્ય કિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ ક્યા નામે ઓળખાય છે ? : **સુમેરુજ્યોતિ (અરોરા)**

ગુજરાતી સાહિત્ય

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. ક્યા સાહિત્યકારે 'પરિક્મા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?
   A) મધુરાય B) ધ્રુવ ભટ્ટ
   C) અમૃતલાલ વેગડ D) રઘુવીર ચૌધરી
2. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
   A) પ્રેમાનંદ 1. ભૂત નિબંધ
   B) શામળ 2. બરાસ કસ્તુરી
   C) કવિ દલતપરામ 3. સાક્ષરજીવન
   D) ગોવર્ધનરામ ત્રિપાઠી 4. રણયજ્ઞ
   A) B-2, A-4, C-1, D-3 B) B-4, C-2, D-3, A-1
   C) A-3, B-2, D-1, C-4 D) D-1, C-2, B-4, A-3
3. ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર્ય કર્યો ?
   A) ગૌરીશંકર જોષી B) જયંત પાઠક
   C) સુરેશ દલાલ D) સ્વામી આનંદ
4. કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.
   A) અબ્દુલ અનવરહુસેન વાસી
   B) અનવર કાદીરઅલી વાસી
   C) અબ્બાસ અબ્દુલઅલી વાસી
   D) અલ્તાફ શૌકતઅલી વાસી
5. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
   A) અંદર દીવાદાંડી B) કેલિડોસ્કોપ
   C) અંતરાત્મા D) મૌનની મહેફિલ
6. કલકત્તામાં શેઠ જીવણલાલની મિલમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?
   A) કવિ કલાપી B) કનૈયાલાલ મુનશી
   C) જયંતી દલાલ D) ઝવેરચંદ મેઘાણી
7. નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?
   A) જુજવા B) મુકમ્ કરોતિ
   C) નિયતિ D) ઉત્તરા
8. સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી ! તમે કિયા પટારે મેલી મારા..'ના રચયિતાનું નામ જણાવો.
   A) બ.ક.ઠાકોર B) વિનોદ જોશી
   C) મકરંદ દવે D) જયન્ત પાઠક
9. 'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.
   A) મકરંદ દવે B) નિરંજન ભગત
   C) રમેશ પારેખ D) વિનોદ જોશી
10. 'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો.
    A) શિયાણી B) શિનોર C) સતારા D) ગાણોલ
11. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
    A) બકુલ ત્રિપાઠી 1. કંથક
    B) ઝુલાબદાસ બ્રોકર 2. ઠીઠ નિશાળીયો
    C) રાજેશ વ્યાસ 3. અદલ
    D) અરદેશર ખબરદાર 4. મિસ્કિન
    A) B-4, A-3, C-2, D-1 B) A-3, B-2, C-1, D-4
    C) C-1, D-2, A-4, B-3 D) D-3, C-4, A-2, B-1
12. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.
    A) શિયાણી B) રાજપીપળા C) શિનોર D) નડિયાદ
13. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?
    A) પ્રેમાનંદ B) દયારામ C) અખો D) દલપતરામ
14. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
    A) નર્મદ B) શામળ C) દલપતરામ D) પ્રેમાનંદ
15. શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.
    A) ઘુંઘટ B) ગોરજ
    C) પારસમણી D) હવાની હવેલી

રેવન્યૂ તલાટી - 28/02/2016

16. 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.
    A)કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી B) કેશવરામ કાશીરામ શાસ્ત્રી
    C)કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી D) કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
17. 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
    A)ગુજરાતનો નાથ B) પૃથ્વીવલ્લભ
    C)પાટણની પ્રભુતા D) જય સોમનાથ
18. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ?
    A)જ્યોતીન્દ્ર દવે B) કનૈયાલાલ મુનશી
    C)રામનારાયણ પાઠક D)ઉમાશંકર જોષી

1)C, 2)A, 3)A, 4)C, 5)B, 6)D, 7)C, 8)B, 9)A, 10)C, 11)D, 12)C, 13)C, 14)D, 15)D, 16)B, 17)A, 18)C.

19. ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

A) કવિ દયારામ B) કવિ દલપતરામ
C) કવિ નર્મદ D) નરસિંહરાવ દિવેટિયા

20. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

A) ગોવિંદે માંડી ગોઠડી B) સંભવામિ યુગે યુગે
C) વિનોદની નજરે D) જ્યોતીન્દ્ર દવે

21. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) 'જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' 1) મીરાં
b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' 2) હરીન્દ્ર દવે
c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' 3) બોટાદકર
d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' 4) નર્મદ

A) a-1, b-4, d-3, c-2 B) d-2, c-1, b-4, a-3
C) c-1, d-2, a-4, b-3 D) b-4, a-2, c-3, d-1

22. 'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

A) મળેલા જીવ B) માનવીની ભવાઈ
C) ગુજરાતનો નાથ D) સરસ્વતીચંદ્ર

23. તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

A) પૂર્વરાગ B) અમૃતા
C) A અને B બન્ને D) આપેલ પૈકી એકપણ નહીં

24. ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

A) શબ્દસૃષ્ટિ B) બુદ્ધિપ્રકાશ
C) પરબ D) ગુજરાત ગૌરવ

25. ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?

A) કવિ ન્હાનાલાલ B) હેમચંદ્રાચાર્ય
C) પ્રેમાનંદ D) નર્મદ

26. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) સુરસિંહજી ગોહિલ 1) તપસ્વિની
b) ન્હાનાલાલ દલપતરામ 2) મહાપ્રસ્થાન
c) કનૈયાલાલ મુનશી 3) કાશ્મીરનો પ્રવાસ
d) ઉમાશંકર જોષી 4) મહેરામણનાં મોતી

A) a-1, d-3, b-4, c-2 B) b-2, c-3, a-4, d-1
C) c-1, a-3, d-2, b-4 D) d-1, b-3, c-4, a-2

27. 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

A) નારાયણ દેસાઈ B) સુરેશ દલાલ
C) રાજેન્દ્ર શાહ D) ઈશ્વર પેટલીકર

28. અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને 'ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ' કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

A) મણિશંકર રત્નજી ભટ્ટ B) રમણભાઈ નીલકંઠ
C) મણિલાલ નભુભાઈ D) મહાકવિ પ્રેમાનંદ

29. 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ?

A) જ્યોતીન્દ્ર દવે B) જ્યોતીન્દ્ર વ્યાસ
C) સતીષ વ્યાસ D) સતીષ દવે

30. ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

A) ગુજરાતી સાહિત્ય પરિષદ B) ગુજરાત સાહિત્ય અકાદમી
C) ગુજરાત વિદ્યાસભા D) ગુજરાત સાહિત્ય સભા

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

31. "સાધના"નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.

A) પખવાડિક B) માસિક C) સાપ્તાહિક D) વાર્ષિક

32. કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો ?

A) જુનાગઢ B) ભાવનગર C) સુરત D) પોરબંદર

33. લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ?

A) સરસ્વતી B) શારદા C) નાઈટ D) રાઈટ

34. અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?

A) ઝવેરચંદ મેઘાણી B) નર્મદ
C) પૂજ્ય શ્રી મોટા D) પ્રેમાનંદ

35. "વૈશમપાયન"કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

A) શિવાનંદ અધ્વર્યુ B) હરીન્દ્ર દવે
C) કરશનદાસ માણેક D) ત્રિભુવન ત્રિવેદી

36. "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ?

A) કિશનસિંહ ચાવડા B) યશવંત મહેતા
C) ધૂમકેતુ D) દલપતરામ

37. "હિમાલયનો પ્રવાસ"કોના દ્વારા લખાયેલ છે ?

A) તેનસીંગ B) સ્વામી સચ્ચિદાનંદજી
C) ગુણવંત શાહ D) કાકા કાલેલકર

19)B, 20)B, 21)B, 22)D, 23)A, 24)C, 25)D, 26)C, 27)A, 28)A, 29)A, 30)D, 31)C, 32)C, 33)A, 34)B, 35)C, 36)A, 37)D.

38. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ?
A)ભાષા વૈભણ B)શબ્દ સૃષ્ટિ
C)પરબ D)સાહિત્ય સૃષ્ટિ

39. 'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?
A)પંદરમી સદીથી સત્તરમી સદી
B)બારમી સદીથી પંદરમી સદી
C)અગીયારમી સદીથી પંદરમી સદી
D)સોળમી સદીથી અઢારમી સદી

40. "કૈવલ્ય ગીતા"ના સર્જકનું નામ જણાવો.
A)નરસિંહ મહેતા B)પ્રેમાનંદ
C)મીરાં D)અખો

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

41. પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
A)ફિલસુફ B)મકરંદ C)હિમાચલ D)સૌજન્ય

42. 'આંધળી માનો કાગળ' કોની રચના છે ?
A)કૃષ્ણલાલ શ્રીધરાણી B)ઈન્દુલાલ ગાંધી
C)વેણીભાઈ પુરોહિત D)પિનાકિન ઠાકોર

43. નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?
A)પનઘટ B)યાત્રા
C)નકશાના નગર D)અમૃતા

44. 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?
A)અમૃતલાલ વેગડ B)કિશોરલાલ મશરૂવાલા
C)મહેન્દ્ર મેઘાણી D)કાકાસાહેબ કાલેલકર

45. ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે ?
A)દયારામ B)દલપતરામ C)પ્રેમાનંદ D)નરસિંહ મહેતા

46. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ?
A)વ્યાકરણ B)કાવ્યશાસ્ત્ર C)રાજનીતિ D)દંડનીતિ

47. ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન.
A)જયભિખ્ખુ એવોર્ડ B)અંબુભાઈ પુરાણી એવોર્ડ
C)રણજિતરામ સુવર્ણચંદ્રક D)એકલવ્ય એવોર્ડ

48. નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ?
A)ગુલાબદાસ બ્રોકર B)રઘુવીર ચૌધરી
C)કનૈયાલાલ મુનશી D)વિનોદ ભટ્ટ

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

49. 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.
A)કનૈયાલાલ મુનશી B)ર.વ.દેસાઈ
C)મનુભાઈ પંચોળી D)ઝવેરચંદ મેઘાણી

50. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો.
A)મેઘનાદ B)શેષ C)ભોમિયો D)કલાપી

51. નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ?
A)સોનેટ B)ગઝલ C)હાઈકુ D)મુક્તક

52. સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે ?
A)4 B)5 C)2 D)3

53. ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?
A)મારી હકીકત B)થોડાં આંસુ થોડાં ફૂલ
C)સત્યના પ્રયોગો D)મારા અનુભવો

54. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?
A)દર બે મહિને B)દર પખવાડિયે
C)દર મહિને D)દર અઠવાડિયે

55. ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?
A)બુદ્ધિવર્ધક સભા B)જ્ઞાનપ્રસારક સભા
C)ગુજરાત સાહિત્ય અકાદમી D)ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

56. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
A)આદિલ મન્સુરી B)અમૃત ઘાયલ
C)બાલાશંકર કંથારિયા D)શૂન્ય પાલનપુરી

57. કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે?
A)જય સોમનાથ B)ચૌલાદેવી
C)ગુજરાતનો નાથ D)પૃથિવીવલ્લભ

58. 'મિસ્કીન' ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?
A)રાજેશ વ્યાસ B)રમણભાઈ નીલકંઠ
C)મધુસુદન ઠક્કર D)મનુભાઈ પંચોળી

59. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ?
A)નર્મદ B)ઉમાશંકર જોશી
C)બોટાદકર D)ખબરદાર

60. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ?
A)મહાન સાહિત્યકાર B)ઉદ્યોગપતિ
C)મહાન ગાયક D)રમતવીર

61. સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો.
A)મરીઝ B)ફિરેફ C)ઘાયલ D)પુનર્વસુ

62. સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?
A)ન્હાનાલાલ -ડોલન શૈલી B)અખો - આખ્યાન
C)ગિજુભાઈ - બાળસાહિત્ય D)દયારામ - ગરબી

63. કયુ જોડકું ખોટું છે ?
A)ધરતીનું લૂણ- સ્વામી આનંદ
B)ઘમ્મર વલોણુ - ઝવેરચંદ મેઘાણી
C)કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
D)હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ

38)B, 39)A, 40)D, 41)D, 42)B, 43)C, 44)D, 45)D, 46)A, 47)C, 48)C, 49)A, 50)D, 51)B, 52)A, 53)A, 54)C, 55)D, 56)C, 57)D, 58)A, 59)D, 60)A, 61)D, 62)B, 63)B.

64. બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મૂછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.
A) મનુભાઈ પંચોલી B) ઠક્કરબાપા
C) ગિજુભાઈ બધેકા D) માનભાઈ ભટ્ટ

65. 'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?
A) સિતાંશુ યશચંદ્ર B) યશવંત શુક્લ
C) ધીરુભાઈ ઠાકર D) અમૃતલાલ યાજ્ઞિક

66. પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?
A) જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
B) રામજી ભા, રૂખી : દરિયાલાલ
C) ગોબર, સંતુ : સંતુ રંગીલી
D) કાનજી, જીવી : મળેલા જીવ

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

67. ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?
A) રાજકોટ B) ગાંધીનગર C) અમદાવાદ D) વડોદરા

68. 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ?
A) રા.વિ.પાઠક B) કનૈયાલાલ મુનશી
C) જયશંકર સુંદરી D) ર.છો. પરીખ

69. ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
A) નંદશંકર B) નર્મદ C) ધૂમકેતુ D) બ.ક.ઠાકોર

70. ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?
A) ધ્વનિ B) ઉષા-સંધ્યા C) યુગવંદના D) યાત્રા

71. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ?
A) સોરઠ તારાં વહેતાં પાણી B) ચકરાવો
C) સરસ્વતી ચંદ્ર D) કરણઘેલો

72. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?
A) વાટિકા B) જલધારા C) તરસ D) પરબ

73. ગુજરાતી ભાષાનો સૌપહેલા શબ્દકોષ કયા લેખકે તૈયાર કરેલો?
A) નર્મદ B) ગોવર્ધનરામ C) દલપતરામ D) નવલરામ

74. 'કલાપી' તખલ્લુસ કોનું છે ?
A) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ B) ન્હાનાલાલ
C) ઉમાશંકર જોષી D) કનૈયાલાલ મુનશી

75. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?
A) કનૈયાલાલ મુનશી B) ર.વ.દેસાઈ
C) નંદશંકર D) ગોવર્ધનરામ ત્રિપાઠી

76. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ક્યો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ?
A) નરસિંહ મહેતા B) શામળ
C) અખો D) દયારામ

77. 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ'. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
A) બોટાદકર B) રા.વી. પાઠક
C) ઉમાશંકર જોષી D) સુંદરમ્

78. 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ?
A) અખો B) મીરાં
C) નરસિંહ મહેતા D) દયારામ

79. 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
A) રાવજી પટેલ B) ઝવેરચંદ મેઘાણી
C) પ્રહલાદ પારેખ D) રાજેન્દ્ર શાહ

80. 'જય જય ગરવી ગુજરાત'ના કવિ કોણ છે ?
A) નર્મદ B) ઉમાશંકર જોષી
C) ન્હાનાલાલ D) દલપતરામ

81. 'ગ્રામલક્ષ્મી'ના લેખક કોણ ?
A) બ.ક.ઠાકોર B) રાજેન્દ્ર શાહ
C) ક.મા.મુનશી D) ર.વ.દેસાઈ

82. ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?
A) ઉમાશંકર - પ્રહલાદ પારેખ B) ન્હાનાલાલ- રા.વિ. પાઠક
C) સુંદરમ્ - ઉમાશંકર D) સુંદરમ્ - બ.ક. ઠાકોર

83. લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
A) વિનોબા ભાવે B) ઝવેરચંદ મેઘાણી
C) ગાંધીજી D) કિશોરલાલ મશરૂવાળા

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

84. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા?
A) પિતા રત્નસિંહજીએ B) શ્રીકૃષ્ણએ
C) માતા વીરકુંવરીએ D) દાદા રાવ દુદાજીએ

85. 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?
A) નાથાલાલ દવે B) હરિહર ભટ્ટ
C) મુકુલ ચોક્સી D) મનોહર ત્રિવેદી

86. 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
A) પ્રેમાનંદ B) નંદશંકર મહેતા
C) શામળ ભટ્ટ D) આનંદશંકર ધ્રુવ

87. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
A) પ્રેમાનંદ B) ભોજો ભગત C) ભાલણ D) શામળ ભટ્ટ

88. 'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના'- આ જાણીતું ગીત કોણે લખ્યું છે ?
A) તુષાર શુક્લ B) હરિન્દ્ર દવે
C) પ્રિયકાન્ત મણિયાર D) મણિલાલ દેસાઈ

64)C, 65)C, 66)C, 67)B, 68)D, 69)C, 70)C, 71)D, 72)D, 73)A, 74)A, 75)D, 76)C, 77)A, 78)B, 79)A, 80)A, 81)D, 82)C, 83)B, 84)D, 85)B, 86)A, 87)D, 88)D.

89. કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં ક્યા નામે ઓળખાય છે?
A) ગુજરાત સાહિત્ય સભા B) ગુજરાત યુનિવર્સિટી
C) ગુજરાત વિદ્યાસભા D) ગુજરાત વિદ્યાપીઠ

90. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?
A) ખબરદાર B) રાવજી પટેલ
C) કવિ નર્મદ D) ભોગીલાલ ગાંધી

91. 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?
A) મનુભાઈ પંચોળી B) ક.મા.મુનશી
C) પન્નાલાલ પટેલ D) જયંત ખત્રી

92. 'ડીમ લાઈટ' રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ?
A) હાસ્ય નિબંધ B) એકાંકી
C) ભવાઈ વેશ D) ટૂંકી વાર્તા

93. ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યું છે ?
A) કાકા કાલેલકર B) વલ્લભભાઈ પટેલ
C) ઝવેરચંદ મેઘાણી D) ફાધર વાલેસ

94. નીચેનામાંથી ક્યા બે કવિઓ સુધારક યુગના છે ?
1. નર્મદ 2. દયારામ 3. દલપતરામ 4. જયંત પાઠક
A) 1 અને 4 B) 2 અને 3 C) 1 અને 3 D) 1 અને 2

95. 'સાંઢ નાથ્યો' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
A) ભવસાગર B) જનમટીપ
C) મારી હૈયા સગડી D) દીપ નિર્વાણ

96. સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો.
1. મનુભાઈ પંચોળી p. મીનપિયાસી
2. ઉમાશંકર જોષી Q. સ્નેહદાન
3. દિનકરરાય વૈદ્ય R. દર્શક
4. કુન્દનિકા કાપડિયા S. વાસુકિ
A) 1-P, 2-Q, 3-R, 4-S B) 1-Q, 2-R, 3-S, 4-P
C) 1-R, 2-P, 3-S, 4-Q D) 1-R, 2-S, 3-P, 4-Q

97. 'રસ્તો કરી જવાના' - ગઝલના રચયિતા કોણ છે ?
A) અમૃત ઘાયલ B) આદિલ મન્સુરી
C) મરીઝ D) બરકત વિરાણી

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

98. 'સ્નેહરશ્મિ' તખલ્લુસ ક્યા ગુજરાતી સાહિત્યકારનું છે ?
A) ત્રિભોવનદાસ લુહાર B) ઝીણાભાઈ દેસાઈ
C) ઉમાશંકર જોશી D) મનુભાઈ પંચોલી

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

99. 'ઈર્શાદ ગઢ' કોનો કાવ્ય સંગ્રહ છે ?
A) મણિશંકર ભટ્ટ B) મકરંદ દવે
C) બ.ક.ઠાકોર D) ચિનુ મોદી

100. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ ક્યું છે ?
A) રાધા-રમણ B) રાસબિહારી C) ધૂમકેતુ D) ચંદ્રકેતુ

101. 'સુંદરમ્' કોનું ઉપનામ છે ?
A) મણિભાઈ હ.પટેલ B) રામપ્રસાદ શુક્લ
C) કનૈયાલાલ મુનશી D) ત્રિભુવનદાસ લુહાર

102. 'ગુજરાતનો નાથ' નવલકથાના લેખક કોણ છે ?
A) પન્નાલાલ પટેલ B) કનૈયાલાલ મુનશી
C) ઈશ્વર પેટલીકર D) કાકા કાલેલકર

103. દર્શક કોનું તખલ્લુસ છે ?
A) નાનાભાઈ દલપતરામ B) પ્રિયકાંત મણિયાર
C) મનુભાઈ પંચોળી D) સુરેશ જોશી

GPSC પેપર - 1 - 2017

104. નીચેના પૈકી કેઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
A) ગુજરાત વિદ્યાપીઠ B) ગુજરાત સાહિત્ય અકાદમી
C) ગુજરાત સાહિત્ય સભા D) ગુજરાત સાહિત્ય પરિષદ

105. યાદી - I અને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

યાદી - I	યાદી - II
1) પરબ	a) ગુજરાત વિદ્યાસભા
2) કુમાર	b) ગુજરાત સાહિત્ય અકાદમી
3) શબ્દસૃષ્ટિ	c) ગુજરાત સાહિત્ય પરિષદ
4) બુદ્ધિ પ્રકાશ	d) કુમાર ટ્રસ્ટ

Codes :

	1	2	3	4
(A)	c	a	d	b
(B)	c	b	a	d
(C)	c	d	b	a
(D)	c	a	b	d

106. 'પીળું ગુલાબ અને હું'ના નાટ્યકાર કોણ છે ?
A) મધુ રાય B) ચિનુ મોદી
C) હસમુખ બારાડી D) લાભશંકર ઠાકર

107. 'યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.' આ પંક્તિ ક્યા કવિ દ્વારા રચવામાં આવી છે ?
A) ન્હાનાલાલ B) ઉમાશંકર જોશી
C) ઝવેરચંદ મેઘાણી D) નર્મદ

89)C, 90)A, 91)A, 92)B, 93)A, 94)C, 95)B, 96)D, 97)A, 98)B, 99)D, 100)C, 101)D, 102)B, 103)C, 104)C, 105)C, 106)D, 107)D.

108. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, "રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી."
A) નાકર B) દયારામ C) ભાલણ D) પ્રેમાનંદ

GPSC MAINS પેપર - 1 - 2016

109. 'ગુજર ભાષા' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?
A) પરમાનંદ B) ભાલણ C) પદ્મનાભ D) અખો

110. 'પ્રસ્થાન' સામાયિક શરૂ કરનાર કોણ હતું ?
A) વિજયરામ વૈદ્ય B) વાડીલાલ ડગલી
C) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી D) રામનારાયણ પાઠક

111. 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
A) ભારતના પ્રારંભિક ઈતિહાસ B) 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
C) અસહકાર આંદોલન D) હિન્દ છોડો લડત

112. 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?
A) નાનાભાઈ ભટ્ટ B) મનુભાઈ પંચોળી 'દર્શક'
C) જુગતરામ દવે D) અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)

113. ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' (War and Peace)નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?
A) નગીનદાસ પારેખ B) જયંતી દલાલ
C) રમણલાલ શાહ D) મણીભાઈ દેસાઈ

114. 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ?
A) વિમળસૂરિ B) હેમચંદ્રાચાર્ય
C) મેરૂતુંગાચાર્ય D) કુમારપાળ

115. કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ?
A) ભાઈનો B) કાકા-ભત્રીજાનો
C) બાપ-દીકરાનો D) ઉપર પૈકી કોઈ નહીં

116. 'વીસમી સદી' સામાયિકના તંત્રી કોણ હતાં ?
A) ઉમાશંકર જોષી B) હાજીમોહમદ અલારખા શીવજી
C) કવિ ન્હાનાલાલ D) રાજા રામમોહન રાય

117. 'જ્ઞાતિ-નિબંધ'ના લેખક કોણ છે ?
A) નર્મદ B) દલપતરામ
C) ગોવર્ધનરામ ત્રિપાઠી D) મણીલાલ નભુભાઈ

118. 'સત્યપ્રકાશ' સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?
A) દાદાભાઈ નવરોજી B) નર્મદ
C) કરસનદાસ મૂળજી D) કેખુસરો કાબરાજી

119. 'આઈને અકબરી' અને 'મિરાતે સિકંદરી' નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?
A) દારા શિકોહ B) વારીસ અલવી
C) બાલશંકર કંથારિયા D) કેશવ હર્ષદ ધ્રુવ

કોન્સ્ટેબલ - 23/10/2016

120. 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિ કોણ છે ?
A) કલાપી B) નર્મદ C) સ્નેહરશ્મિ D) કાન્ત

કોન્સ્ટેબલ - 2015

121. જોડકા જોડો
P) પન્નાલાલ પટેલ 1) સરસ્વતી ચંદ્ર
Q) ઝવેરચંદ મેઘાણી 2) ગુજરાતનો નાથ
R) કનૈયાલાલ મુનશી 3) માનવીની ભવાઈ
S) ગોવર્ધનરામ ત્રિપાઠી 4) સૌરાષ્ટ્રની રસધાર
A) P-4, Q-1, R-3, S-2 B) P-3, Q-4, R-2, S-1
C) P-2, Q-3, R-1, S-4 D) P-1, Q-2, R-4, S-3

122. ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ'ની રચના કોણે કરી છે ?
A) નરસિંહ મહેતા B) મહાત્મા ગાંધી
C) સરોજિની નાયડુ D) રવિન્દ્રનાથ ટાગોર

બિન સચિવાલય ક્લાર્ક - 2016

123. 'શું શા પૈસા ચાર'એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?
A) પ્રેમાનંદ B) શામળ C) દયારામ D) અખો

124. પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.
A) શામળ B) અખો C) પ્રેમાનંદ D) નર્મદ

125. કવિ શ્રી ઉમાશંકર જોષીનું પુરુ નામ જણાવો.
A) ઉમાશંકર નર્મદાશંકર જોષી B) ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી
C) ઉમાશંકર આત્મારામ જોષી D) ઉમાશંકર જેઠાલાલ જોષી

126. પ્રસિદ્ધ કાવ્ય "કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે."ના સર્જકનું નામ જણાવો.
A) રમણભાઈ નીલકંઠ B) આનંદશંકર ધ્રુવ
C) મણિલાલ નભુભાઈ D) સ્વામી આનંદ

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

127. ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?
A) ક. મા. મુનશી B) ગોવર્ધનરામ ત્રિપાઠી
C) ઉમાશંકર જોષી D) ચંદ્રકાન્ત બક્ષી

108)D, 109)B, 110)D, 111)B, 112)A, 113)B, 114)B, 115)C, 116)B, 117)B, 118)C, 119)C, 120)B, 121)B, 122)A, 123)A, 124)B, 125)D, 126)C, 127)C.

128. ધીરા ભગતના પદો ક્યા નામે જાણીતા છે ?
A)પ્રભાતિયા B)ગરબી C)રાસ D)કાફી

129. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?
A)સવાયા ગુજરાતી B)પાટણની પ્રભુતા
C)ભગ્ન પાદુકા D)મુનશીનું મનોમંથન

130. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યું છે?
A)માણાવદર B)તળાજા C)સોમનાથ D)વંથલી

GPSC પ્રિલિમ - 2001

131. "શબ્દસૃષ્ટિ" કઈ સંસ્થાનું સામયિક છે ?
A)ગુજરાત વિદ્યાસભા B)ગુજરાત સાહિત્યસભા
C)ગુજરાત સાહિત્ય અકાદમી D)ગુજરાતી સાહિત્ય પરિષદ

132. ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ?
A)મનુભાઈ પંચોળી B)ધીરુભાઈ ઠાકર
C)યશવંત શુક્લ D)ડો.કેશુભાઈ દેસાઈ

133. "ઉચ્ચ શિક્ષણ" : ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ ?
A)દાઉદભાઈ ઘાંચી B)પ્રા.નિરંજન દવે
C)ડો.ચંદ્રકાન્ત મહેતા D)ડો.ગુણવંત શાહ

134. આમાં લબ્ધપ્રતિષ્ઠ હાસ્યકાર કોણ ?
A)ઉમાશંકર જોષી B)હરીન્દ્ર દવે
C)વિનોદ ભટ્ટ D)કુન્દનિકા કાપડિયા

135. "લીલુડી ધરતી"ના લેખક કોણ ?
A)પન્નાલાલ પટેલ B)પિતાંબર પટેલ
C)રઘુવીર ચૌધરી D)ચુનીલાલ મડિયા

136. "અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ" પુસ્તક કોના વિશે છે ?
A)મહાદેવભાઈ દેસાઈ B)મહાત્મા ગાંધી
C)પંડિત જવાહરલાલ નેહરુ D)સરદાર પટેલ

137. આમાં આધુનિક કોણ ?
A)આનંદશંકર ધ્રુવ B)બ.ક. ઠાકોર
C)સીતાંશુ યશચંદ્ર D)નરસિંહરાવ દિવેટીયા

138. 'ભારેલો અગ્નિ'ના લેખક કોણ ?
A)રમણલાલ દેસાઈ B)ઝવેરચંદ મેઘાણી
C)રઘુવીર ચૌધરી D)પ્રિયકાંત પરીખ

139. આંગળિયાતના લેખક કોણ ?
A)અશ્વિની ભટ્ટ B)પન્નાલાલ પટેલ
C)જોસેફ મેકવાન D)ઈશ્વર પેટલીકર

140. આમાં હાસ્યકાર કોણ નથી ?
A)વિનોદ ભટ્ટ B)બકુલ ત્રિપાઠી
C)અશોક દવે D)રમણલાલ જોષી

GPSC પ્રિલિમ - 2007

141. આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ?
A)કાંતિ ભટ્ટ B)શિવકુમાર જોષી
C)ગુણવંત શાહ D)અનિલ જોષી

142. 'સ્નેહરશ્મિ' ક્યાં લેખકનું ઉપનામ છે ?
A)મનુભાઈ પંચોળી B)ઝીણાભાઈ દેસાઈ
C)રામનારાયણ પાઠક D)કાકા કાલેલકર

GPSC પ્રિલિમ - 2014

143. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?
A)કનૈયાલાલ મુનશી B)ઝવેરચંદ મેઘાણી
C)ગાંધીજી D)જવાહરલાલ નેહરુ

PSI ખાતાકીય - 23/04/2017

144. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો ?
A)ચોટીલા B)ધંધુકા C)ધ્રાંગધ્રા D)સાયલા

145. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી ?
A)કનૈયાલાલ મુનશી B)કાકાસાહેબ કાલેલકર
C)પન્નાલાલ પટેલ D)રઘુવીર ચૌધરી

146. 'માણભટ્ટ'તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ ક્યા છે ?
A)દયારામ B)પ્રેમાનંદ
C)નરસિંહ મહેતા D)દલપતરામ

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

147. કાકાસાહેબ કાલેલકરનું પુરું નામ જણાવો.
A)લાભશંકર જાદવજી ઠાકર B)કાનજીભાઈ રામસિંહ ભટ્ટ
C)દતાત્રેય હરિકૃષ્ણ કાલેલકર D)દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

148. 'કુંવરબાઈનું મામેરૂ' આખ્યાનકૃતિ ક્યા કવિની છે?
A)નરસિંહ મહેતા B)કવિ દલપતરામ
C)કવિ પ્રેમાનંદ D)ન્હાનાલાલ

PSI/ASI GK - 2/5/2015

149. કુંદનિકા કાપડીયા એ કઈ નવલકથા લખી છે ?
A)લીલેરો ઢાળ B)માનવીની ભવાઈ
C)સાત પગલા આકાશમાં D)આશકા માંડલ

150. જય સોમનાથ નવલકથા કોને લખી છે ?
A)ચંદ્રવદન મહેતા B)મકરંદ દવે
C)જયંત પાઠક D)ક.મા. મુનશી

128)D, 129)C, 130)B, 131)C, 132)B, 133)D, 134)C, 135)D, 136)A, 137)C, 138)A, 139)C, 140)D, 141)D, 142)B, 143)A, 144)A, 145)B, 146)B, 147)D, 148)C, 149)C, 150)D.

151. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
A)દર્શક B)ઘાયલ C)સ્નેહ રશ્મિ D)કલાપી

152. ઓખાહરણના સર્જકનું નામ શું છે ?
A)નરસિંહ મહેતા B)મીરાબાઈ
C)અખો D)પ્રેમાનંદ

153. મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?
A)સ્વ.મૂળશંકર ભટ્ટ B)સ્વ.ગીજુભાઈ બધેકા
C)સ્વ.હરભાઈ ત્રિવેદી D)સ્વ.નાનાભાઈ ભટ્ટ

154. શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
A)નિબંધકાર B)નવલકથાકાર
C)આખ્યાનકાર D)વાર્તાકાર

155. પુનર્વસુ એ કોનું બીજુ નામ છે ?
A)લાભશંકર ઠાકર B)ગૌરીશંકર જોષી
C)રામનારાયણ પાઠક D)પન્નાલાલ પટેલ

156. જળકમળ છાંડી જાને બાળા .... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.
A)કૃષ્ણને B)નંદગોપને C)નાગને D)બલરામને

157. પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?
A)આત્મકથા B)નવલિકા C)નવલકથા D)આખ્યાન

GPSC Class-1 - 2016

158. "ભણકારા" સોનેટમાળાના કવિ કોણ છે ?
A)બ.ક. ઠાકોર B)ઉમાશંકર જોશી
C)રાજેન્દ્ર શાહ D)"સુંદરમ"

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

159. લેખક અને લેખન પ્રકારને યોગ્ય રીતે જોડો.
1) શ્રી ચીનુ મોદી A)નાટક - એક ઉંદર અને જદુનાથ
2) શ્રી ગીજુભાઈ બધેકા B)ટૂંકી વાર્તા - 'ટોખુ'
3) ઘનશ્યામ દેસાઈ C)બાળવાર્તાઓ
4) લાભશંકર ઠાકર D)ગઝલ - સ્થળાંતર
A)1-C, 2-B, 3-A, 4-D B)1-B, 2-A, 3-D, 4-C
C)1-D, 2-C, 3-B, 4-A D)1-A, 2-D, 3-C, 4-B

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

160. "સરસ્વતીચંદ્ર" નવલકથાના લેખક કોણ છે?
A)ક.મા.મુનશી B)નર્મદ
C)રસીકલાલ પરીખ D)ગોવર્ધનરામ ત્રિપાઠી

161. 1967 શ્રી ઉમાશંકર જોષીને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો?
A)માનવીની ભવાઈ B)આંદોલન
C)નિશીથ D)વેણુવત્સલા

GPSC Class - 2 - 18/12/2016

162. 'મંડળી મળવાથી થતા લાભ' નિબંધ કોણે લખ્યો હતો?
A)દલપતરામ B)નર્મદ
C)ગોવર્ધનરામ ત્રિપાઠી D)નંદશંકર મહેતા

163. 'ભટનું ભોપાળું' નાટક કોણે લખ્યું છે?
A)નર્મદ B)નંદશંકર તુળજાશંકર મહેતા
C)નવલરામ લક્ષ્મીરામ પંડ્યા D)મૂળજી ભટ્ટ

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

164. નીચેના પૈકી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી?
A)ઓખાહરણ B)મદનમોહન
C)સુદામા ચરિત્ર D)નળાખ્યાન

165. ગુજરાત સાહિત્યમાં પ્રથમ નવલકથા "કરણઘેલો" લખનાર કોણ હતા?
A)મહીપતરામ રૂપરામ B)ઝવેરચંદ મેઘાણી
C)નંદશંકર મહેતા D)દલપતરામ

166. "ઝેર તો પીધા છે જાણી જાણી" ના લેખક કોણ છે?
A)સ્નેહરશ્મિ B)રઘુવીર ચૌધરી
C)ધૂમકેતુ D)મનુભાઈ પંચોલી

GPSC Class - 2 - 12/2/2017

167. લેખક અને તેમની રચનાને યોગ્ય રીત ગોઠવો.
1) આનંદ શંકર ધ્રુવ A)હિરેફ વાતો
2) કાકા કાલેલકર B)ઉગમણો દેશ જાપાન
3) રા.વિ.પાઠક C)સાહિત્ય વિચાર
4) ઝવેરચંદ મેઘાણી D)સૌરાષ્ટ્રની રસધાર
A)1 -B, 2 -A, 3 -D, 4 -C B)1 -C, 2 -B, 3 -A, 4 -D
C)1 -A, 2 -D, 3 -C, 4 -B D)1 -D, 2 -C, 3 -B, 4 -A

GPSC Class - 2 - 28/1/2017

168. ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેનાં પૈકી કોનું યોગદાન નથી?
A)શ્રી ગિજુભાઈ બધેકા B)શ્રી જીવરામ જોષી
C)શ્રી રમણલાલ શાહ D)શ્રી પ્રવીણ પટેલ

151)B, 152)D, 153)B, 154)A, 155)A, 156)A, 157)A, 158)A, 159)C, 160)D, 161)C, 162)B, 163)C, 164)B, 165)C, 166)D, 167)B, 168)D.

GPSC Class-1 - 15/01/2017

169. સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ હતો?
A)શ્રી પન્નાલાલ પટેલ B)જી.શંકર કુરુપ
C)શ્રી રાજેન્દ્ર શાહ D)શ્રી રઘુવીર ચૌધરી

170. રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
A)ગુજરાત સાહિત્ય પરિષદ B)ગુજરાત સાહિત્ય સભા
C)ગુજરાત વર્નાક્યુલર સાસોયટી D)ગુજરાત સરકાર

GPSC Class-1 - 15/01/2017

171. નીચેની પંક્તિ કોની છે ?
લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે.
A)નર્મદ B)દલપતરામ C)કરસનદાસ D)તુકારામ

172. સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ .... નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું ?
A)હિતેચ્છુ B)સમશેર બહાદુર
C)દેશી મિત્ર D)સત્યપ્રકાશ

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

173. "સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ" ક્યાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે?
A)ટૂંકી વાર્તા B)એકાંકી C)હાઈકૂ D)નિબંધ

174. "અંતે આરંભ" રચના માટે 2015નું સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
A)લાભ શંકર ઠાકર B)વર્ષા અડાલજા
C)રસીક શાહ D)ચીનુ મોદી

GPSC Class - 2 - 16/04/2017

175. લેખક અને કૃતિનું કયુ જોડકું યોગ્ય નથી?
1) કવિ નર્મદ - પૂર્વાલાપ
2) નરસિંહરાવ દિવેટીયા - તરંગલીલા
3) મણિલાલ દ્વિવેદી - સુદર્શન ગ્રંથાવલિ
4) સર રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
5) ન્હાનાલાલ દલપતરામ - વેરની વસુલાત
A)1 અને 2 B)2 અને 3 C)3 અને 4 D)1 અને 5

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

176. "ગુજરાત સાહિત્ય સભા"ની સ્થાપના કોણે કરી હતી ?
A)ક. મા. મુનશી B)ઉમાશંકર જોશી
C)રણજિતરામ વાવાભાઈ મહેતા D)શેઠ કસ્તુરભાઈ લાલભાઈ

GPSC આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) - 26/03/2017

177. લેખક અને કૃતિઓ પૈકીનું ક્યું જોડકું યોગ્ય નથી ?
1. મહાત્મા ગાંધી : સત્યના પ્રયોગો
2. નરેન્દ્ર મોદી : કર્મયોગ
3. ગોવર્ધનરામ ત્રિપાઠી : સરસ્વતી ચંદ્ર
4. ક.મા.મુનશી : મળેલા જીવ
A)1 B)2 C)3 D)4

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

178. ઈ.સ. 1400ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન કયા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા "રણમલ છંદ" નામની કૃતિ રચવામાં આવેલ?
A)ગોંડલ B)ઝાલાવાડ C)ઈડર D)ભાવનગર

179. નીચેનાં પૈકી કોણે "ડાંડીયો" પખવાડિકનો આરંભ કર્યો?
A)નિરંજન ભગત B)ઉમાશંકર જોશી
C)દલપતરામ D)નર્મદ

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

180. "જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે?
A)કવિ ખબરદાર B)કવિ મુન્શી
C)કવિ પન્નાલાલ D)કવિ નર્મદ

181. મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો?
A)જૂનાગઢ B)શ્રીનાથજી C)ડાકોર D)દ્વારકા

182. ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું?
A)વિનોબા ભાવે B)સ્વામી આનંદ
C)કાકા કાલેલકર D)ધર્માનંદ કોસંબી

183. પોતાના પુસ્તક "માણસાઈના દીવા" માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમ્યાન કઈ વ્યકિત સાથેના અનુભવો આલેખ્યાં છે?
A)ગાંધીજી B)રવિશંકર મહારાજ
C)સરદાર પટેલ D)વિઠ્ઠલભાઈ પટેલ

184. "અણસાર" નવલકથા કોણે લખી છે?
A)ધૂમકેતુ B)ગુલાબદાસ બ્રોકર
C)વર્ષા અડાલજા D)નિરંજન ભગત

185. "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે?
A)સુરેશ જોષી B)વિનોદ ભટ્ટ
C)ભોળાભાઈ પટેલ D)રઘુવીર ચૌધરી

186. "વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંકિતનાં કવયિત્રીનું નામ શું છે?
A)મીરાંબાઈ B)દિવાળીબાઈ C)ગવરીબાઈ D)ગંગાસતી

169)B, 170)B, 171)B, 172)D, 173)C, 174)C, 175)D, 176)C, 177)D, 178)C, 179)D, 180)A, 181)D, 182)C, 183)B, 184)C, 185)A, 186)D.

187. "ચતુર ચાલીસી" અને પ્રેમપચીસી" નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો.
A)પ્રિતમદાસ B)વિશ્વનાથ જાની C) રત્નેશ્વર D) વિરજી

GPSC Class - 2 - 18/03/2017

188. લેખકો અને કૃતિઓને ધ્યાને લઈને કયુ જોડકુ યોગ્ય નથી તે જણાવો.
1) પ્રેમાનંદ - ઓખા હરણ 2) અખો - પંચીકરણ
3) કવિ નર્મદ - કવિચરિત્ર 4) બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
A)1 B)2 C)3 D)4

GPSC Class - 1 - 28/01/2017

189. 'ચાબખા' સાહિત્યસ્વરૂપમાં રચનાઓ નીચેનામાંથી કોણે કરી છે?
A)ભોજા ભગત B) ધીરો C) શામળ D)નાકર
190. નીચેનામાંથી કયું જોડકુ બંધ બેસતું નથી?
A)કરણ ઘેલો - નંદશંકર મહેતા
B)મારી હકીકત - નર્મદ
C)બંધન અને મુક્તિ-મનુભાઈ પંચોળી
D)ધુળસળી - પન્નાલાલ પટેલ

નાયબ ચિટનીશ - 02/06/2015

191. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
A)આનંદશંકર ધ્રુવ B) નંદશંકર મહેતા
C)મહાત્માં ગાંધી D) ગોવર્ધનરામ ત્રિપાઠી
192. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?
A)નાકર B)વિશ્વનાથ C) ભાલણ D)પ્રેમાનંદ
193. 'નિશાન ચુક માફ નહી માફ નીચુ નિશાન' આ પંકિત ક્યા કવિની છે ?
A)બ.ક.ઠાકોર B) કલાપી
C)નરસિંહરાવ દિવેટીયા D)સુંદરમ્
194. નીચેનામાંથી ક્યા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?
A)ચંદ્રકાંત બક્ષી B) કિશોરસિંહ સોલંકી
C)રઘુવીર ચૌધરી D)નીતિન વડગામા
195. 'અડધી સદીની વાંચન યાત્રા' ના સંપાદક કોણ છે?
A)ઉમાશંકર જોષી B) કિશોરલાલ મશરૂવાળા
C)ઝવેરચંદ મેઘાણી D) મહેન્દ્ર મેઘાણી
196. નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
A)કાકાસાહેબ કાલેલકર B) રાવજી પટેલ
C)હરીષ મિનાશ્રુ D) મકરંદ દવે

197. 'અતિજ્ઞાન' કાન્તનું ક્યા પ્રકારનું કાવ્ય છે ?
A)સોનેટ B)આખ્યાન ખંડ
C)ખંડકાવ્ય D)મહાકાવ્ય
198. 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે?
A)ઉમાશંકર જોષી B)કલાપી
C)સુંદરમ્ D)દલપતરામ
199. દયારામ નામ સાથે ક્યું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલ છે ?
A)પદ B)ગરબી C)પદ્યવાર્તા D)આખ્યાન
200. 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?
A)કિશોરલાલ મશરૂવાળા B)કાર્લ માર્ક્સ
C)નરહરિ પરિખ D)એમ.એન.રાય
201. નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી ક્યું છે ?
A)વિશ્વગીતા B)જ્ઞાનગીતા C)પ્રેમરસગીતા D)હરિગીત
202. ક્યા સર્જકને 'અમિર નગરીના ગરીબ ફકીર'નું બિરૂદ મળેલું છે?
A)ઠક્કર બાપા B)ધૂમકેતુ
C)ઈન્દુલાલ યાજ્ઞિક D)જ્યોતિન્દ્ર દવે
203. 'સ્મરણયાત્રા' એ ક્યા સર્જકની જાણીતી આત્મકથા છે?
A)નરસિંહરાવ દિવેટીયા B)જયંત પાઠક
C)ચંદ્રવદન ચી.મહેતા D)કાકાસાહેબ કાલેલકર
204. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ....છે.
A)નવજીવન B)શબ્દસૃષ્ટિ C)પરબ D)ગોવાળ

નાયબ ચિટનીશ - 05/02/2017

205. 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?
A)ગુજરાત સાહિત્ય અકાદમી B)બાળ સાહિત્ય અકાદમી
C)બાળ વિશ્વવિદ્યાલય D)ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
206. 'દાણલીલા' કૃષ્ણવિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું ?
A)મીરાંબાઈ B)પ્રેમાનંદ
C)અખો D)નરસિંહ મહેતા
207. બાલાશંકર કંથારીયાનું તખલ્લુસ ક્યું છે ?
A)પુનિત B)અઝીઝ C)કલાંત D)ચંડુલ
208. નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?
A)મધુકર ઉપાધ્યાય B)મધુસૂદન પારેખ
C)મધુ કોઠારી D)મધુસૂદન ઠાકર
209. 'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ?
A)મીનાક્ષી ઠાકર B)શરદ ઠાકર
C)નિર્મિશ ઠાકર D)લાભશંકર ઠાકર
210. નીચેનામાંથી ક્યા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?
A)જ્યોતીન્દ્ર દવે B)રતિલાલ બોરીસાગર
C)વિનોદ ભટ્ટ D)બકુલ ત્રિપાઠી

187)B, 188)D, 189)A, 190)D, 191)D, 192)C, 193)A, 194)A, 195)D, 196)A, 197)C, 198)B, 199)B, 200)C, 201)A, 202)C, 203)D, 204)B, 205)C, 206)B, 207)C, 208)D, 209)D, 210)B.

211. નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ?
A) ઉત્તરોત્તર B) કિનારે કિનારે
C) સપ્તપદી D) પંડિત આકાશ

GPSC Class - 2 - 16/04/2017

212. લેખકો અને તેઓની ઉપનામ પૈકી કયુ જોડકુ યોગ્ય નથી?
1) શ્રી ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિ
2) શ્રી ઉમાશંકર જોષી - વાસુકી
3) શ્રી ત્રિભોવનદાસ લુહાર - સુન્દરમ
4) શ્રી અમૃતલાલજી ભટ્ટ - ઈર્શાદ
A) 4 B) 3 C) 2 D) 1

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

213. 1) રા.વિ. પાઠક (અ) ધૂમકેતુ
2) નટવરલાલ પંડ્યા (બ) સુંદરમ્
3) ત્રિભોવનદાસ લૂહાર (ક) સ્વૈરવિહારી
4) ગૌરીશંકર જોષી (ડ) ઉશનસ્
જોડકાનો સાચો વિકલ્પ કયો છે ?

	1	2	3	4
(A)	(અ)	(બ)	(ક)	(ડ)
(B)	(ક)	(ડ)	(અ)	(બ)
(C)	(ક)	(ડ)	(બ)	(અ)
(D)	(અ)	(બ)	(ક)	(ક)

214. "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ કોણે ઊતાર્યો ?
A) બ.ક. ઠાકોર B) નર્મદ C) દલપતરામ D) ન્હાનાલાલ

215. જોડકાં જોડો.
1) મનુભાઈ પંચોલી (અ) સોક્રેટીસ
2) ઈશ્વર પેટલીકર (બ) વેરની વસુલાત
3) ક.મા. મુનશી (ક) આંગળીયાત
4) જોસેફ મેકવાન (ડ) જનમટીપ
A) 1-ક, 2-બ, 3-ડ, 4-અ B) 1-અ, 2-બ, 3-ડ, 4-અ
C) 1-અ, 2-ડ, 3-બ, 4-ક D) 1-બ, 2-ડ, 3-ક, 4-અ

216. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં ગામમાં થયો હતો ?
A) તળાજા B) જૂનાગઢ C) સિહોર D) ઘોઘા

217. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ?
A) દલપતરામ B) નારાયણ હેમચંદ્ર
C) મણીલાલભાઈ નભુભાઈ દ્વિવેદી D) નર્મદ

GPSC Class - 2 - 12/02/2017

218. ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે?
A) પ્રાચીન વાર્તાઓ
B) પ્રાચીન કવિઓ
C) જીવનકથાઓ
D) ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

GPSC Class - 1 - 09/04/2017

219. અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય કયુ છે ?
A) હિન્દુઓની પડતી B) રાજ્યરંગ
C) રૂદનરસિક D) મારી હકિકત

GPSC Class - 2 - 04/03/2017

220. 'અહલ્યા થી એલિઝાબેથ' કૃતિ કોની છે ?
A) હિમાંશી સેલત B) સરોજ પાઠક
C) વિનોદિની નીલકંઠ D) ઈલા આરબ મહેતા

GPSC Class - 2 - 18/03/2017

221. 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' કઈ સંસ્થા આપે છે ?
A) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
B) ગુજરાતી સાહિત્ય પરિષદ
C) ગુજરાત સાહિત્ય સભા
D) ગુજરાતી સાહિત્ય અકાદમી

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર કલાસ - 2 (25/2/2017)

222. પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલેખ્યું છે ?
A) વટપદ્રક B) વીરક્ષેત્ર
C) સંસ્કારી નગરી D) વટપુર

GPSC Class - 2 - 5/3/2017

223. નીચેના પૈકી કઈ નવલકથા શ્રી ક.મા. મુનશી દ્વારા લખવામાં આવેલી નથી ?
A) ગુજરાતનો નાથ B) પાટણની પ્રભુતા
C) રાજાધિરાજ D) માણસનાં મન

211)C, 212)A, 213)C, 214)A, 215)C, 216)A, 217)D, 218)C, 219)A, 220)B, 221)D, 222)B, 223)D.

GPSC Class - 2 - 11/12/2016

224. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં અગત્યનો ફાળો કોનો રહેલ છે ?
A) કવિ નર્મદ B) રમણભાઈ નીલકંઠ
C) એલેક્ઝાન્ડર ફાર્બસ D) સરોજીની નાયડુ

225. નીચેના પૈકી કઈ નવલકથા 'મનુભાઈ પંચોલી' દર્શકની નથી ?
A) બંધન અને મુક્તિ B) દીપ નિર્વાણ
C) સોક્રેટીસ D) પરિવર્તન

GPSC Class - 2 - 05/02/2017

226. નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?
A) ચંદ બરદાઈ - પૃથ્વીરાજ રાસો
B) કવિ બદરૂદિન - શાહનામા
C) કૃષ્ણ-વૃષ્ટિ - નરસિંહ મહેતા
D) ગોવિંદગમન - નરસિંહ મહેતા

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

227. વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ ક્યો ?
A) હેરફેર B) ઝરમર C) ક્લબલ D) અરસપરસ

228. 'સુંદરમ્' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ?
A) ઠાકર B) લુહાર C) ત્રિપાઠી D) સુથાર

229. કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે ?
A) બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર B) શિવાજી બાલમુકુંદ કાલેલકર
C) બાલમુકુંદ શિવાજી કાલેલકર D) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

230. કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ?
A) 04/04/1944 B) 05/05/1955
C) 06/06/1966 D) 03/03/1933

231. 'માય ડિયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ?
A) મણિલાલ હ. પટેલ B) નર્મદાશંકર દવે
C) જયંતીલાલ ગોહેલ D) લાભશંકર ઠાકર

232. 'બહેનનો પત્ર' કૃતિમાં બહેનનું નામ શું છે ?
A) અનુષ્કા B) અનન્યા C) અનુશ્રી D) અનુજા

233. ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ?
A) કવિ દલપતરામ B) કલાપી
C) સુંદરમ્ D) કવિ બોટાદકર

234. ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ?
A) ચંદ્રકાન્ત શેઠ B) કુમારપાળ દેસાઈ
C) મનુભાઈ પંચોળી D) ત્રિભુવનદાસ લુહાર

235. 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ?
A) અંકિત ત્રિવેદી B) હર્ષદેવ માધવ
C) જલન માતરી D) ચીનુ મોદી

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

236. 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો.
A) સવૈયા B) ચોપાઈ C) દોહરો D) મનહર

237. 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો.
A) કવિ નર્મદ B) સુંદરમ
C) ઝવેરચંદ મેઘાણી D) દુલા ભાયા કાગ

238. છપ્પા ક્યા કવિએ લખ્યા છે ?
A) શામળ B) નરસિંહ C) ધીરો D) અખો

239. 'ધૂમકેતુ' ઉપનામ ક્યા સર્જકનું છે ?
A) ગૌરીશંકર માધવરામ જોશી
B) ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
C) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
D) ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી

240. નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ?
A) નિરંજન ભગત B) જ્યોતીન્દ્ર દવે
C) રતિલાલ બોરીસાગર D) વિનોદ ભટ્ટ

241. નરસિંહ મહેતાના પદ .... નામે પ્રસિદ્ધ થયા છે ?
A) ચાબખા B) ઝૂલણા C) પ્રભાતિયાં D) કાફી

242. 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ?
A) 4 B) 1 C) 2 D) 3

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

243. ચકોર (બંસી વમી) ગુજરાતના જાણીતા .... છે.
A) કાર્ટૂનિસ્ટ B) શિલ્પકાર C) ચિત્રકાર D) નૃત્યકાર

GSSSB મિકેનિક - 2017

244. નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો.
A) એમ ઉગાર્યો ચંદ્રહાસ B) કેમ પૂજા કરું ?
C) જે કોઈ પ્રેમ અંશ અવતરે D) શું કરવું છે મારે ?

245. ગઝલને ગુજરાતમાં સૌપ્રથમ માનભર્યું સ્થાન આપનાર કવિનું નામ આપો.
A) બાલાશંકર કંથારિયા B) રમણભાઈ નીલકંઠ
C) દલપતરામ D) નર્મદ

224)C, 225)D, 226)C, 227)B, 228)B, 229)D, 230)A, 231)C, 232)B, 233)B, 234)D, 235)D, 236)B, 237)A, 238)D, 239)C, 240)A, 241)C, 242)A, 243)A, 244)C, 245)A.

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

246. 'પૃથ્વીવલ્લભ' નવલકથાનો વિષય શો છે ?
A)ઐતિહાસિક B)સામાજિક C)ધાર્મિક D)પૌરાણિક

247. ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે ?
A)ક.મા. મુનશી B)ર.વ. દેસાઈ
C)લાભશંકર ઠાકર D)રાજેન્દ્ર શાહ

248. સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?
A)સુરેશ જોષી B)રઘુવીર ચૌધરી
C)કિશોરલાલ મશરૂવાલા D)કનૈયાલાલ મુનશી

249. ક્યા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઈતિહાસમાં સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે ?
A)આલ્કીસ્ટન્ટ B)ટી.સી. હોઈ
C)એ.કે. ફાર્બસ D)એસ.એન. સ્કોટ

250. 'ઊશનસ્' એ કોનું તખલ્લુસ છે ?
A)રા. વિ. પાઠક B)આર. વી. દેસાઈ
C)ત્રિભુવનદાસ લુહાર D)નટવરલાલ પંડ્યા

251. મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું?
A)આદિ કવિ B)રાષ્ટ્રીય શાયર
C)મૂળ કવિ D)કવિ શિરોમણિ

252. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી ?
A)કનૈયાલાલ મુનશી B)કાકાસાહેબ કાલેલકર
C)પન્નાલાલ પટેલ D)રઘુવીર ચૌધરી

GSSSB સર્વેયર - 2016-17

253. પ્રસિદ્ધ પ્રાર્થના 'મંગલ મંદિર ખોલો, દયામય'ના રચયિતાનું નામ જણાવો.
A)નરસિંહ મહેતા B)નરસિંહરાવ દિવેટિયા
C)ગોવર્ધનરામ ત્રિપાઠી D)કવિ ન્હાનાલાલ

254. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો.
A)તળાજા B)વડોદરા C)જેતલપુર D)સુરત

255. કવિ ઉમાશંકર જોષીને ક્યા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
A)વિશ્વશાંતિ B)ધારાવસ્ત્ર C)ગંગોત્રી D)નિશીથ

મુખ્ય સેવિકા - 8/1/2017

256. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?
A) નરસિંહ મહેતા B) કવિ નર્મદ
C) મહ્દત દવે D) કે.કા.શાસ્ત્રી

257. કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો
A) દરજી B)સોની C) લુહાર D) સુથાર

258. અસીમ રાંદેરીનું નામ શું છે ?
A) મહમુદમિયાં મહમદ ઈમામ
B)સૈયદ અમીર હસન
C) સૈયદ અબ્દુલ વહીદ D)અલીખાન ઉસમાનખાન બલુચ

વિસ્તરણ અધિકારી - 7/1/2017

259. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?
A) મહમંદ બલોચ B) અલીખાન બલોચ
C) સરદાર બલોચ D) શેહશાહ બલોચ

260. નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ?
A) હિમાલયના હિંડોળે B) નવી દૃષ્ટિ
C) હિમાલયનો પ્રવાસ D) પૂર્વ યુરોપનો પ્રવાસ

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

261. વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે?
A)ચાબખા B)આરતી C)થાળ D)ગરબા

262. 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો.
A)ધીરો B)દયારામ
C)ભાલણ D)ભોજા ભગત

263. રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?
A)તેડાગર B)અમૃતકુંભ
C)ઉપરવાસ કથાયત્રી D)અમૃતા

264. ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?
A)તાદર્થ્ય B)પરબ C)કેળવણી D)કુમાર

265. નીચેનામાંની ક્યા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી?
A)રઘુવીર ચૌધરી B)રાજેન્દ્ર શાહ
C)ઉમાશંકર જોષી D)રમેશ પારેખ

266. જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.
A)માય ડીયર જયુ B)જયેન્દ્ર શેખડીવાળા
C)ઘનશ્યામ D)સેહેની

267. પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
A)પ્રેમાનંદ B)નાકર C)વિષ્ણુદાસ D)શામળ

268. ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે?
A)કરણઘેલો B)સાસુ વહુની લડાઈ
C)સોરઠ તારા વહેતા પાણી D)સરસ્વતીચંદ્ર

269. મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે?
A)વ્રજ-ગુજરાતી B)રાજસ્થાની
C)વ્રજ D)હિન્દી - ગુજરાતી

246)A, 247)A, 248)D, 249)C, 250)D, 251)B, 252)B, 253)B, 254)B, 255)D, 256)B, 257)B, 258)A, 259)B, 260)C, 261)D, 262)D, 263)D, 264)B, 265)D, 266)A, 267)D, 268)D, 269)A.

270. નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે?
A)પદ્યવાર્તા B)ગરબા C)પ્રભાતિયા D)છપ્પા

271. ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?
A)કલાપી B)ન્હાનાલાલ C)કાન્ત D)બ.ક.ઠાકોર

272. સત્યના પ્રયોગ આત્મકથા ક્યા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?
A)ગાંધીજી B)કાકાસાહેબ C)રા.વી.પાઠક D)મુંનશી

273. ગુજરાતીની પ્રથમ નવલકથા ક્યા સર્જક પાસેથી પાપ્ત થાય છે?
A)નવલરામ B)નરસિહ રાવ
C)નંદશંકર મહેતા D)નર્મદ

274. પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
A)દર્શક B)ઝવેરચંદ મેઘાણી
C)ચુનિલાલ મડિયા D)પન્નાલાલ પટેલ

275. 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો.
A)પીતામ્બર પટેલ B)પન્નાલાલ પટેલ
C)રાવજી પટેલ D)ઈશ્વર પેટલીકર

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

276. "કવિ શિરોમણી" નું નામ કોને મળ્યું ?
A)નરસિંહ મહેતા B)પ્રેમાનંદ
C)નર્મદ D)દલપતરામ

277. કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે ?
A)અમરેલી B)જુનાગઢ
C)ભાવનગર D)ગીર સોમનાથ

278. ગૂજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર "કાકા કાલેલકર"નો જન્મ કયો થયો હતો ?
A)મુંબઈ B)વડોદરા C)નાસિક D)સતારા

279. નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી ?
A)રણજીતરામ સુવર્ણચંદ્રક
B)રણજીટ્રોફી
C)ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર
D)દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017

280. 'વેરની વસુલાત' નવલકથાના લેખક કોણ છે ?
A)કનૈયાલાલ મુનશી B)નર્મદ
C)રા.વિ. પાઠક D)પન્નાલાલ પટેલ

281. 'ઈર્શાદ' ક્યા કવિનું ઉપનામ છે ?
A)પ્રિયકાન્ત મણિયાર B)મકરંદ દવે
C)સુરેશ જોષી D)ચીનુ મોદી

282. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ?
A)જ્યોતીન્દ્ર દવે B)કનૈયાલાલ મુનશી
C)રામનારાયણ પાઠક D)ઉમાશંકર જોષી

PSI/ASI ગુજરાતી - 2/5/2015

283. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે ?
A)સ્વૈરવિહારી B)સ્નેહરશ્મિ C)પ્રિયદર્શી D)ઉશનસ

284. ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા ક્યા નામે શરૂ થઈ હતી ?
A)ગુજરાત સાહિત્ય સભા B)ગુજરાત સાહિત્ય સોસાયટી
C)ગુજરાત વર્નર સાહિત્ય સભા D)ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

285. લોહીની સગાઈ ક્યા પ્રકારની સાહિત્યક રચના છે?
A)નવલકથા B)નવલિકા
C)કાવ્યસંગ્રહ D)એકાંકીનાટક

286. બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા?
A)ગિજુભાઈ બધેકા B)ઈશ્વર પેટલીકર
C)રમણભાઈ નીલકંઠ D)કાકાસાહેબ કાલેલકર

287. સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે.
A)વર્ષા અડાલજા B)ધીરૂબેન પટેલ
C)મકરંદ દવે D)કુંદનિકા કાપડીયા

288. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે.
A)નવલકથા B)નાટક C)કાવ્ય D)નિબંધ

289. 'હિન્દુ ધર્મની બાળપોથી' કૃતિના લેખક કોણ છે ?
A)સ્વામી આનંદ B)નરસિંહ મહેતા
C)શંકરાચાર્ય D)આનંદશંકર ધ્રુવ

290. 'અંગત' કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે?
A)કવિ નર્મદ B)રાવજી પટેલ
C)પન્નાલાલ પટેલ D)મણિશંકર ભટ્ટ

291. નીચેનામાંથી ક્યું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે ?
A)પ્રગતિશીલ શિક્ષણ B)ભૂમિપત્ર
C)નિરીક્ષક D)પરબ

292. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ?
A)અખંડાનંદ B)નવચેતન C)સંસ્કૃતિ D)દાંડિયો

293. ગુજરાતી ભાષાનો 'સાર્થ જોડણી કોષ' કઈ સંસ્થાનું પ્રકાશન છે?
A)નવજીવન પ્રકાશન B)ગુજરાત વિદ્યાપીઠ
C)ગુજરાત સાહિત્ય પરિષદ D)ગુજરાત સાહિત્ય સભા

294. જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ છે ?
A)નરસિંહ મહેતા B)નર્મદ
C)દયારામ D)દલપતરામ

270)C, 271)C, 272)A, 273)C, 274)B, 275)D, 276)B, 277)A, 278)D, 279)B, 280)A, 281)D, 282)C, 283)B, 284)D, 285)B, 286)A, 287)D, 288)D, 289)D, 290)B, 291)D, 292)D, 293)B, 294)B.

295. આધુનિ સર્જક કોણ નથી ?
A)મધુ રાય B)કિશોર જાદવ
C)સુરેશ જોષી D)દલપતરામ

296. આધુનિક કવિ કોણ છે ?
A)મનસુખલાલ ઝવેરી B)પુજાલાલ
C)બાલમુકુંદ દવે D)સીતાંશુ યશચંદ્ર

297. દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.
A)કરશનદાસ મુળજી B)નર્મદ
C)દલપતરામ D)હરગોવિંદદાસ કાંટાવાલા

298. નીચેનામાંથી ક્યું ઘટકતત્વ હાઈકુમાં આવતું નથી ?
A)ચિંતન B)સત્તર અક્ષર C)ચિત્ર D)કલ્પના

299. ભૂત નિબંધના લેખક કોણ છે ?
A)મનસુખરામ B)દલપતરામ
C)નવલરામ D)ગોવર્ધનરામ

300. જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ક્યા ગુજરાતી લેખકને મળ્યો છે ?
A)નારાયણ દેસાઈ B)પન્નાલાલ પટેલ
C)દર્શક D)રાજેન્દ્ર શાહ

301. ક્યા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ?
1. શરીસ વીજલીવાળા 2. મનોજ પરમાર
2. હિમાંશી શેલત 4. મનોજ ખંડેરીયા
A)3 અને 4 B)1 અને 4 C)1 અને 2 D)3 અને 2

302. મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.
A)દયારામ B)કેવળપુરી C)દલપતરામ D)રવિ સાહેબ

303. બે કવિઓ સુધારક યુગના નથી.
1. જયંત પાઠક 2. દલપતરામ
3. ઉશનસ 4. નર્મદ
A)1 અને 4 B)1 અને 2 C)1 અને 3 D)2 અને 4

304. ગુજરાતીમાં કરૂણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?
A)દયારામ B)ગોવર્ધનરામ
C)નવલરામ D)દલપતરામ

305. જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે - આ ઉક્તિ કોની છે ?
A)ઝવેરચંદ મેઘાણી B)નરસિંહ મહેતા
C)મોહનદાસ કરમચંદ ગાંધી D)ખબરદાર

306. સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ?
A)આચાર્ય વિનોબા ભાવે B)મહાત્મા ગાંધી
C)જયપ્રકાશ નારાયણ D)જવાહરલાલ નેહરુ

307. અંધારી ગલીમાં સફેદ ટપકાકની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?
A)દિગીશ મહેતા B)લીલાબહેન
C)અમૃત જાની D)હિમાંશી શેલત

308. ભારતીય વિદ્યાભવન દ્વારા ક્યું સામયિ બહાર પાડવામાં આવે છે?
A)અખંડાનંદ B)બુદ્ધિપ્રકાશ
C)અભિયાન D)નવનીત સમર્પણ

309. મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી આખ્યાનકાર કોણ હતા ?
A)અખો B)દયારામ C)પ્રેમાનંદ D)શામળ

310. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ?
A)માનવીની ભવાઈ B)લોહીની સગાઈ
C)કરણઘેલો D)ઝેર તો પીધા જાણી જાણી

311. ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે........
A)માનવીની ભવાઈ B)ગ્રામલક્ષ્મી
C)ભવની ભવાઈ D)ઝેર તો પીધા જાણી જાણી

312. ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?
A)મોહનભાઈ પટેલ B)પન્નાલાલ પટેલ
C)કાકાસાહેબ કાલેલકર D)ભોળાભાઈ પટેલ

313. હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે ?
A)નયન હેમ B)સિદ્ધ હેમ
C)અષ્ટાધ્યાયી D)હેમ વ્યાકરણ

314. કલાપીનો કેકારવ કોની રચના છે ?
A)સુરસિંહજી ગોહિલ B)નરસિંહરાવ દિવેટિયા
C)ઝવેરચંદ મેઘાણી D)રમણભાઈ નીલકંઠ

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

315. 'આદિલ' મન્સૂરીનું પૂરું નામ જણાવો.
A)મહમ્મદ ફકીર ગુલામનબી મન્સૂરી
B)ગુલામનબી મહમ્મદ ફકીર મન્સૂરી
C)ફકીર મહમ્મદ ગુલામનબી મન્સૂરી
D)ગુલામનબી ફકીર મહમ્મદ મન્સૂરી

316. 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ?
A)દયારામ B)નરસિંહ મહેતા
C)પ્રેમાનંદ D)શામળ

317. 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ?
A)મીરાં B)નરસિંહ C)દયારામ D)શામળ

318. 'ડાંડિયો' મુખપત્ર કોણે શરૂ કર્યું હતું ?
A)ન્હાનાલાલ B)કાન્ત C)કલાપી D)નર્મદ

319. નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ?
A)ગૌરીશંકર જોશી B)વિનોદ જોશી
C)સુરેશ જોશી D)ઉમાશંકર જોશી

320. 'ધૂમકેતુ'નું મૂળ નામ શું છે ?
A)ગુલાબદાસ B)પ્રેમશંકર C)સોમનાથ D)ગૌરીશંકર

295)D, 296)D, 297)D, 298)A, 299)B, 300)C, 301)B, 302)C, 303)C, 304)D, 305)B, 306)B, 307)D, 308)D, 309)C, 310)C, 311)A, 312)A, 313)B, 314)A, 315)C, 316)B, 317)C, 318)D, 319)D, 320)D.

321. નર્મદને નીચેનામાંથી કયું બિરુદ નથી મળ્યું ?

A)ગદ્યનો પિતા B)અર્વાચીનોમાં આદ્ય

C)સમયમૂર્તિ D)સવાઈ ગુજરાતી

322. 1972 માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને "ભીની માટી ગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો" કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો.

A)બાલમુકુન્દ દવે B)વેણીભાઈ પુરોહિત

C)જયન્ત પાઠક D)નટવરલાલ પંડ્યા

323. 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય'ના લેખનકારનું નામ જણાવો.

A)જયન્ત પાઠક B)હરીન્દ્ર દવે

C)સુરેશ દલાલ D)બાલમુકુન્દ દવે

324. કવિ 'ઉશનસ્'નું મૂળ નામ જણાવો.

A)નર્મદાશંકર રેવાશંકર મહેતા

B)ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ

C)નટવરલાલ કુબેરભાઈ પંડ્યા

D)નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા

HTAT - 2014

325. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા ગોવાલણીના લેખક કોણ છે? : મલયાનીલ

326. ગુજરાતી સાહિત્યમાં આવેલો સાહિત્યપ્રકાર સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો છે? : ખંડકાવ્ય

327. હુ તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળી આ ટીલડી કોણે જડી ?- પંક્તિના રચયિતા કોણ છે? : સુન્દરમ્

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

328. 'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા દશ્ય-અદશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે? - સુરેશ દલાલ

329. કવિ વેણીભાઈ પુરોહિતના સૌપ્રથમ કાવ્યનું નામ જણાવો. - પુરાણો દીવડો

330. 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? - નાનાલાલ

ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

331. ગુજરાતની પ્રથમ મહાનવલકથા સરસ્વતીચંદ્રના લેખક કોણ છે? - ગોવર્ધનરામ ત્રિપાઠી

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

332. નીચેની પંક્તિના રચયિતા કવિ કોણ છે ?

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં.

- હરીન્દ્ર દવે

333. સાપના ભારા અને ઉઘાડી બારી એ કોની કૃતિઓ છે ?

- ઉમાશંકર જોષી

334. નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ?

- પ્રેમરસગીતા

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

335. કવિ નર્મદ ' અવસાન સંદેશ' કાવ્ય દ્વારા લોકોને શાનો સંદેશ આપે છે? - પોતાના મૃત્યુ પછી સ્નેહીજનોએ શોક કરવો નહી, હિંમતથી મૃત્યુના દુઃખને સહન કરવું, શોક કરવાને બદલે પ્રભુ સ્મરણ કરવું જોઈએ

336. 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? - ગુજરાતનો નાથ

337. હાઈકુ ક્યા દેશનો કાવ્ય પ્રકાર છે? - જાપાનનો

338. 'માણભટ્ટ' તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ ક્યા છે? - પ્રેમાનંદ

339. 'કાશ્મીરનો પ્રવાસ' ગ્રંથના લેખક કોણ? - કલાપી

પ્રોબેશન ઓફિસર - 2016

340. ગુજરાતી સાહિત્યનું સૌથી લઘુ સાહિત્ય સ્વરૂપ ક્યું છે ?

- હાઈકુ

341. 'ધૂમકેતુ' કોનું ઉપનામ છે ? - ગૌરીશંકર ગો. જોશી

342. 'રાષ્ટ્રીય શાયર' તરીકે ક્યા કવિની ગણના થાય છે ? - ઝવેરચંદ મેઘાણી

343. 1967માં ગુજરાતના ક્યા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? - ઉમાશંકર જોષી

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

344. મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? - બે ખાનાનો પરિગ્રહ

345. કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

- ઈસ્માઈલભાઈ નાગોરી

346. ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? - પ્રશ્ન

347. કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? - ભરૂચ

348. 'કવિ શિરોમણિ'નું માન પામેલા કવિ કોણ ? - પ્રેમાનંદ

349. છગનભાઈ, ચકુ, ઈન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ? - વૃક્ષ

350. કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? - વાડીલાલ

351. 'પરિક્રમા', 'કુંતલ'એ કોના કાવ્યસંગ્રહો છે ? - બાલમુકુંદ દવે

352. 'શેષ' ઉપનામ ધરાવતા કવિ ક્યા ? - રા.વિ.પાઠક

353. કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

- વેધશાળાનું

354. કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગરે કોના કાવ્યસંગ્રહો છે ?

- સુંદરમ્

355. 'સોનેટ'- કાવ્યપ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે ? - 14

356. કવિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો ? - 1967

321)D, 322)D, 323)A, 324)C.

357. કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? - ચૂડી બનાવવાના
358. ધૂમકેતુની વાર્તાનો જુમો ક્યા ગામમાં રહેતો હતો?- આણંદપુર
359. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? - પંદરમી
360. અમરતકાકી- કઈ કૃતિનું પાત્ર છે ? - લોહીની સગાઈ
361. 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? - ભાણાભાઈ ગીડા
362. 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી'- પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ? - ગ્રામમાતા
363. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરૂદ આપ્યું હતું ? - રાષ્ટ્રીય શાયર
364. કવિ રમેશ પારેખનો જન્મ ક્યા થયો હતો ? - અમરેલી
365. 'રાવણનું મિથ્યાભિમાન' કથાકાવ્યના રચયિતા કોણ છે ? - ગિરધર
366. 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? - પન્નાલાલ પટેલ
367. 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે? - આત્મકથા ખંડ
368. 'ગુજરાત મોરી મોરી રે'- કાવ્યના કવિ કોણ ? - ઉમાશંકર જોશી
369. 'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? - ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ-1
370. 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? - ચુનીલાલ મડિયા
371. 'સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે'- પંક્તિ ક્યા કવિની છે? - કલાપી
372. 'સોનેટ' કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? - ચૌદ
373. બરકત વીરાણીનું ઉપનામ જણાવો. - બેફામ
374. 'મહાકવિ'નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ? - પ્રેમાનંદ
375. રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? - દ્વિરેફ
376. 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? - પન્નાલાલ પટેલ
377. કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? - ધીરો
378. 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. - બોટાદકર
379. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ક્યું છે ? - બાપાની પીંપર
380. 'કસુંબીનો રંગ' કાવ્ય ક્યા કવિનું છે ? - ઝવેરચંદ મેઘાણી
381. 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? - રમણભાઈ નીલકંઠ
382. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યું છે ? - શબ્દ સૃષ્ટિ
383. ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ ક્યુ છે ? - સુન્દરમ્
384. 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? - ભાલણ
385. સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? - બ.ક.ઠાકોર
386. ગરબીઓના ગાયક કોણ છે ? - દયારામ
387. નરસિંહ મહેતાને ક્યો છંદ પ્રિય હતો ? - ઝુલણા
388. 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. - મલયાનિલ
389. 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. - પન્નાલાલ પટેલ
390. 'ડાંડિયો' સામયિક કોણે શરૂ કર્યું હતું ? - નર્મદ
391. 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. - રમેશ પારેખ
392. ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? - સુરેશ જોશી
393. 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'- આ રચનાના કવિનું નામ જણાવો. - હરીન્દ્ર દવે
394. 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. - ચિનુ મોદી
395. 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? - મીરાં

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

396. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' એમ કોણે કહ્યું છે ? - કવિ ખબરદાર

મહેસૂલી તલાટી - 2014

397. ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાક મિથુન, કચ-દેવયાની એ ક્યો પ્રકાર કહેવાય? - ખંડકાવ્ય
398. દયારામ નામ સાથે ક્યું સાહિત્યસ્વરૂપ સંકળાયેલું છે ? - ગરબી
399. 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે? - પન્નાલાલ પટેલ
400. 'ભોળી રે ભરવાડણ......' પદના રચયિતા કોણ છે ? મીરાંબાઈ
401. 'શીગડુ' વાર્તાના લેખક કોણ છે? - સુરેશ જોશી

TET- II - ભાષા - 2014

402. જયભિખ્ખુએ ક્યા નાટકના રચયિતા છે ? - રસિયો વાલમ
403. 'કાફી' નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે ? - ધીરો
404. 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા.' સ્તુતિ અષ્ટકના રચયિતા કોણ ? - કવિ ન્હાનાલાલ

TET- II - ભાષા - 2015

405. સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે ? - મારૂ જીવન એ જ મારી વાણી
406. શૂન્ય પાલનપુરી ઉપનામ ક્યા કવિનું છે ? - બલુચ અલીખાન ઉસ્માનખાન
407. ક્યા કવિ આખ્યાનકાર તરીકે પ્રખ્યાત છે ? - પ્રેમાનંદ
408. કૃતિ અને સાહિત્યકારનાં જોડકુ - ઉપરવાસ- રઘુવીર ચૌધરી, આંગળિયાત - જોસેફ મેકવાન, લીલુડી ધરતી- ચુનીલાલ મડિયા

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

409. ''જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરુ'' આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? - મહાકવિ પ્રેમાનંદ

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર ક્લાર્ક - 2012

410. સાહિત્યકાર 'ગૌરીશંકર જોષી'નું 'તખલ્લુસ' ક્યું છે? - ધૂમકેતુ

જૂનિયર ક્લાર્ક પેપર - 1 - 2012

411. ક્યો વિકલ્પ સાચો છે?
- ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા, મારી હકીકત - નર્મદ, કાન્હડદે પ્રબંધ - પદ્મનાભ

412. નીચેના કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી છે?
- મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..... - રાવજી પટેલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ....! - કવિ બોટાદકર, હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..... - રાજેન્દ્ર શુક્લ

413. પ્રથમ ગુજરાતી ટૂંકીવાર્તાનું શીર્ષક શું હતું? - ગોવાળણી

414. જમો થાળ જીવન જાઉં વારી કોણે લખ્યું છે? - ભુમાનંદ સ્વામી

415. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ક્યો સાહિત્ય-પ્રકાર નથી?
- સોનેટ

416. વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો ક્યો પ્રકાર છે?
- એકાંકી

417. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ? - મારી હકીકત

418. મદનમોહના આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે?
- પદ્યવાર્તા

419. મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે? - નરસિંહરાવ દિવેટીયા

420. નીચે દર્શાવેલ કવિઓ અને તેમનાં કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી છે? - મન નો ડગે - ગંગાસતી, અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ, તીર્થોત્તમ - બાલમુકુંદ મણિશંકર દવે

421. ટેલ-ઓફ ટૂ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે?
- ડૉ. પી.સી. વૈદ્ય

422. ડીમ લાઈટ એકાંકીના લેખક કોણ છે? - રઘુવીર ચૌધરી

423. નીચે દર્શાવેલ ગઝલના રચયિતા (ગઝલકાર) કોણ છે?
નયનને બંધ રાખીને......
- બરકત વીરાણી

424. ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જનનું નામ શું છે?
- પ્રેમાનંદ

425. નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.
મોજાંને ચીંધવા સહેલા નથી.
- સુરેશ દલાલ

426. નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે?
- અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ

427. પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો : જક્કલા - પૃથિવીવલ્લભ

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

428. નીચે દર્શાવેલ સાહિત્યકૃતિઓમાં ક્યું જોડકું સાચું છે?
- કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી, જનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર, રાત રહે જયાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા

429. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે જાણીતા સર્જક કોણ છે? - કવિ નર્મદ

નાયબ મામલતદાર/DY.S.o - 2012

430. ગુજરાતી સાહિત્ય સર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી છે? - મહાકવિ પ્રેમાનંદ-વડોદરા, ભક્તકવિ દયારામ-ડભોઈ, કવિવર નર્મદ-સુરત

431. દેખ બિચારી બકરી કેરો જોતાં ન કોઈ પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તુ હિન્દુસ્તાન - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ ક્યાં કવિની છે? - દલપતરામ

નાયબ મામલતદાર/DY.S.o - 2015

432. જીગર અને અમી.................સાહિત્યકારની રચના છે. - ચુનીલાલ શાહ

433. 'ઈંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ .... છે? - રાજેન્દ્ર શાહ

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

434. 'જય જય ગરવી ગુજરાત' ગીતના રચયિતાનું નામ જણાવો.
- કવિ નર્મદ

435. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો? - ચોટીલા

436. રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોની કલમ દ્વારા લખાયેલ છે? - ઝવેરચંદ મેઘાણી

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

437. ગાંધીજીએ જેમને 'સવાઈ ગુજરાતી'નું બિરુદ આપ્યું છે તે......... - કાકાસાહેબ કાલેલકર

438. ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો સ્વામી (પિતા) તરીકે કોને ઓળખવામાં આવે છે? - નર્મદ

TET- I - 2012/2014

439. 'માણભટ્ટ' તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? - પ્રેમાનંદ

440. 'હજારો વર્ષની જૂની અમારી વેદના' આ કાવ્યપંક્તિ ક્યા કવિની રચના છે? - ઝવેરચંદ મેઘાણી

441. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
- ચાર

442. કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે? - ઘનશ્યામ

સબરજિસ્ટ્રાર - 2013

443. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાતના રચયિતાનું નામ શું છે? - નર્મદ

444. "મા-બાપને ભુલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી? - સંત પુનિત મહારાજ

445. "સરસ્વતીચંદ્ર" એ કોની કૃતિ છે? - ગોવર્ધનરામ ત્રિપાઠી

TAT - 2012

446. સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે? - ઝવેરચંદ મેઘાણી

447. આત્મકથાત્મક રચના હુંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ .... ના વેશમાં મદદ કરી હતી. - શામળા શેઠ

HTAT - 2012

448. કવિ-શિરોમણીનું માન કોને મળ્યું છે? - **પ્રેમાનંદ**

449. ઝવેરચંદ મેઘાણી સર્જન
- શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ, નિસર્ગ

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

450. 'પર્વત તારા' કાવ્યના કવિ કોણ છે? - **સુરેશ દલાલ**

451. 'શરદીના પ્રતાપે' કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
- હાસ્યવાર્તા

452. 'ચાંદાલો ગમે'... કાવ્યના કવિ કોણ છે? - **જયંત શુકલ**

453. 'બકરીબેન' વાર્તાના લેખક કોણ છે? - **જુગતરામ દવે**

454. ' હું તો પૂછું' કાવ્યના કવિ કોણ છે? - **સુંદરમ**

455. 'મૂછાળીમાં કોનું તખલ્લુસ છે? - **ગીજુભાઈ બધેકા**

456. 'માનવીની ભવાઈ' ના લેખક કોણ છે? - **પન્નાલાલ પટેલ**

PSI - 2012

457. ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? - **કાળ ચક્ર**

458. ક્યા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકિ છે ? - **ઉમાશંકર જોશી**

459. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા ?
- ચુનિલાલ મડીયા

PSI નશાબંધી - 2011

460. 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' ગીતના કવિ..........છે. - **રમેશ પારેખ**

461. નીચેની કૃતિના સાચા સાહિત્ય પ્રકાર સામે ટીક કરો. - અતિજ્ઞાન
- ખંડકાવ્ય

એકાઉન્ટ ઓફિસર - 1999

462. બાળકેળવીકાર ક્ષેત્રે મુછાળી મા તરીકે જાણીતા હતા
- ગિજુભાઈ બધેકા

463. ગુજરાતી સાહિત્યમાં દર્શક તરીકે ઓળખાય - **મનુભાઈ પંચોળી**

464. જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? - **કનૈયાલાલ મુનશી**

ચીફ ઓફિસર - 1999

465. 'કુરુક્ષેત્ર' નવલકથાના રચયિતા કોણ છે ? - **દર્શક**

466. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર જણાવો. - **પરબ**

467. 'સાત પગલા આકાશમાં' નવલકથા કોણી લખી છે ?
- કુંદનિકા કાપડિયા

468. ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા થયું હતું ? - **ગૂજરાત વિદ્યાપીઠ**

469. 'નિશીથ' કૃતિના સર્જક કોણ છે ? - **ઉમાશંકર જોશી**

470. ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકરનું ક્યા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ? - **નિબંધ**

471. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ક્યા પ્રકારની સાહિત્યિક રચના છે?
- જીવનચરિત્ર

472. 'અમૃતા' નવલકથાના લેખક કોણ છે ? - **રઘુવીર ચૌધરી**

473. 'ગુજરાતી લઘુકથાના જનક' તરીકે કોણ ઓળખાય છે ?
- મોહનલાલ પટેલ

આયુર્વેદિક ડોક્ટર - 2000

474. 'પાટણની પ્રભુતા', 'પૃથ્વીવલ્લભ', 'રાજાધિરાજ'ના લેખક કોણ છે ? - **કનૈયાલાલ મુનશી**

વૈદકિય સેવા - 2000

475. હું માનવી માનવ થાઉ તો ઘણું- કાવ્યપંક્તિના કવિ કોણ છે ?
- ત્રિભુવનદાસ લુહાર (સુન્દરમ્)

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

476. હિમાલય એટલે અવધૂતની પથારી અને મુમુક્ષુઓનું પિયર કોણે કહ્યું છે ? : કાકા કાલેલકર

477. ____ જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર : જનનીની

478. મમતા મળી ગઈ મોંઘેરી ગુજરાતના સર્જક કોણ છે? : ઉમાશંકર જોશી

479. ક્યા લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે ? : **રામનારાયણ પાઠક**

480. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે? : **ગુજરાત સાહિત્ય સભા**

481. ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ? : **નર્મદ**

482. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કોણે આપી ? : કવિ કલાપી

483. બાળકેળવણીની મુછાળી મા કોણ કહેવાતું ? : ગિજુભાઈ બધેકા

484. ગુજરાતી ભાષાના સાર્થ જોડણીકોશ કઈ સંસ્થાનું પ્રકાશન છે ?
: ગૂજરાત વિદ્યાપીઠ

485. ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે ક્યા કવિની પંક્તિ છે? : **ઉમાશંકર જોશી**

486. ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો ? : **પ્રેમાનંદ**

487. લોકસાહિત્યના સંશોધન - સંપાદનમાં સૌથી મોટું કામ કોનું ગણાય ? : **ઝવેરચંદ મેઘાણી**

488. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબના ચરિત્રનાયક કોણ છે? : **મહાદેવભાઈ દેસાઈ (લેખક - નારાયણ દેસાઈ છે)**

489. મંગલ મંદિર ખોલો પંક્તિના રચયિતા કોણ છે? : **નરસિંહરાવ દિવેટિયા**

490. માણસાઈના દીવાના ચરિત્રનાયક કોણ છે? : **રવિશંકર મહારાજ**

491. મહાજાતિ ગુજરાતી પુસ્તકના લેખક કોણ છે ? : **ચંદ્રકાન્ત બક્ષી**

492. મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ કયું છે? : **કાન્ત**

493. ઠેઠ નિશાળીયો ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? : **બકુલ ત્રિપાઠી**

494. મનોજ ખંડેરિયાનું પ્રદાન શેમાં છે? : **ગઝલ**

495. કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃત ઉપનિષદ કહેવાય ? : **અખેગીતા**

496. છેલ્લો ઝેરનો કટોરો પી જજો બાપુના રચયિતા કોણ છે? : **ઝવેરચંદ મેઘાણી**

497. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? : **મનુભાઈ પંચોળી**

498. કવિ ન્હાનાલાલ શેના માટે પ્રખ્યાત છે? : ડોલનશૈલી

499. ગુજરાતની અસ્મિતાના ઉદ્‌ગાતા તરીકે ક્યા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે ? : **કનૈયાલાલ મુનશી**

500. લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. : **પીયૂષ - ઝરણાં**

501. નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં ક્યા છંદમાં જોવા મળે છે? : **ઝૂલણાં**

501. મિથ્યાભિમાન - કૃતિના લેખક કોણ છે ? - **દલપતરામ ત્રવાડી**

502. ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધક અને વિવેચક જયંત કોઠારીનું જન્મસ્થળ જણાવો. : **રાજકોટ**

503. આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ક્યા જિલ્લામાં આવેલું છે? : **ભાવનગર**

504. ગુજરાતી સાહિત્યમાં 'ખંડ કાવ્યના પિતા' કોને કહેવામાં આવે છે ? : **મણિશંકર ભટ્ટ**

505. ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે ? : **કે.કા. શાસ્ત્રી**

506. ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કોણે આપ્યું હતું ? : **ગાંધીજી**

507. 'ગુજરાતના ગાલિબ' તરીકે ક્યા ગઝલકારની ઓળખ છે ? : **મરીઝ**

508. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. : **ધંધુકા**

509. 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ ? : **પન્નાલાલ પટેલ**

510. લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો. : **ધોળકા**

511. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાનગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? : **ગરબડે**

512. નવ કરશો કોઈ શોક - કૃતિના લેખક કોણ છે ? - **નર્મદાશંકર દવે**

513. ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. : **શીમળાનાં ફૂલ**

514. 'મારો ધર્મ સાચો તેથી તારો ધર્મ ખોટો' એમ કહેનારા ધર્મ માટે નહીં પણ ધર્મ ઉપર ચોંટાડેલાં લેવલ માટે લડે છે' આ વિધાન ક્યા સાહિત્યકારનું છે ? : **યશવંત શુક્લ**

515. પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામર, પશુવત વ્યવહાર કરતાં દર્શાવ્યા છે ? : દેવોને

516. બાળસાહિત્યકારના અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠની પ્રસિદ્ધ રચના જણાવો. : **અંગુલિનો સ્પર્શ**

517. નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. : **ધંધુકા**

518. નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા 'કરણઘેલો' ક્યા વર્ષમાં લખી ? : **1866**

519. 'કવિ શિરોમણી' તરીકેનું સન્માન પામનાર કવિનું નામ જણાવો. : **પ્રેમાનંદ**

520. લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. : **સાંણથળી**

521. લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે છંદમાં લખાયેલા છે ? : **ઝૂલણા**

522. સાહિત્યકાર જયંત કોઠારીને તેમના ક્યા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? : **સાહિત્યિક તથ્યોની માવજત**

523. નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. : **મંડળી મળવાથી થતા લાભ**

524. રમણીયતા કૃતિના લેખક કોણ છે ? - **નગીનદાસ પારેખ**

525. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. : **વડોદરા**

526. કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. : **દામોદર ખુશાલદાસ બોટાદકર**

527. 'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે' આ વિધાન કોનું છે? : **નાનાભાઈ ભટ્ટ**

528. હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. : **હળવાં ફૂલ**

529. ....ના લેખનમાં વાસ્તવિક જીવનની ઝલક જોવા મળે છે, વાત્રકના કાંઠે, સુખ દુઃખના સાથી, માનવીની ભવાઈ તેઓની પ્રસિદ્ધ કૃતિઓ છે. - **પન્નાલાલ પટેલ**

530. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- **લક્ષ્મી-દલપતરામ, ગુલાબ-નગીનદાસ મારફતીયા, ભટનું ભોપાળુ-નવલરામ પંડ્યા, કૃષ્ણકુમારી- નર્મદ**

531. બરકતઅલી ગુલામઅલી વિરાણીનું તખલ્લુસ (ઉપનામ) જણાવો. - બેફામ

532. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- **પિત્તળની ચામડીનો બોદો રણકાર- ગુલામ મોહમ્મદ શેખ, જટાયુ- સિતાંશુ યશચંદ્ર, તડકો-લાભશંકર ઠાકર, બનારસ ડાયરી-હરીશ મિનાશ્રુ**

533. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. - **રાઈનો પર્વત-રમણભાઈ નીલકંઠ, તુલસીક્યારો-ઝવેરચંદ મેઘાણી, ગંગોત્રી-ઉમાશંકર જોશી, મળેલા જીવ- પન્નાલાલ પટેલ**

534. 'અંધારી ગલીમાં સફેદ ટપકાં'ના લેખક કોણ છે ? - **હિમાંશી શેલત**

535. સંતો ! અમે વહેવારિયા રચના જણાવો. - **નરસિંહ મહેતા**

536. 'કન્યા વિદાય'ના લેખક કોણ છે ? - **અનિલ જોષી**

537. 'વાંસનો અંકુર' કોની કૃતિ છે ? - **ધીરુબહેન પટેલ**

538. આગગાડી કૃતિના લેખક જણાવો. - **ચંદ્રવદન ચીમનલાલ મહેતા**

539. 'વળાવી બા આવ્યા' કૃતિ રચિત છે - **નટવરલાલ પંડ્યા**

540. લાભશંકર ઠાકરનો જન્મ ક્યા થયો હતો ? - **પાટડી (સુરેન્દ્રનગર)**

541. જય સોમનાથ કૃતિનો પ્રકાર જણાવો. - **નવલકથા**

542. 'તત્વમસી'ના લેખક જણાવો. - **ધ્રુવ ભટ્ટ**

543. ગોવિંદો પ્રાણ અમારી રે'ના રચયિતા કોણ છે ? - **મીરાંબાઈ**

544. 'ચંદન' રચિત છે - **દામોદાર બોટાદકર**

545. લાભશંકર ઠાકર કઈ બાબતનું ઉંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા હતા ? - **આયુર્વેદ**

546. ધ્વનિ કાવ્ય સંગ્રહના રચયિતા જણાવો. - **રાજેન્દ્ર શાહ**

547. બ્રિટિશ રાજ સામે સામુદાયિક જાગૃતિ વધારવા માટેનું 'દાંડીયો'નું પ્રકાશન .... દ્વારા થયું હતું. - **કવિ નર્મદ**

548. પુરંદર પરાજયનો સાહિત્ય પ્રકાર જણાવો. - **નાટક**

549. દરિયાલાલ કોની રચના છે ? - **ગુણવંતરાય આચાર્ય**

550. જીવરામ ભટ્ટના મતે ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટારનો અર્થ શો થાય છે ? - **દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકાં અને લીટા લીટા કરે છે**

551. 'નવા વર્ષના સંકલ્પો' કૃતિના સર્જક જણાવો. - **બકુલ ત્રિપાઠી**

552. જોડકા યોગ્ય રીતે જોડો. - **શામળશાનો વિવાહ- નરસિંહ મહેતા, રસિક વલ્લભ-દયારામ, કુંવરબાઈનું મામેરુ-પ્રેમાનંદ, શતાવરી-પૂજાલાલ**

553. અબ્બાસ અબ્દુલઅલી વાસીનું તખલ્લુસ કયું છે ? - **મરીઝ**

554. ઉમાશંકર જોશી કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલા છે ? - **ગુજરાત યુનિવર્સિટી**

555. 'સંસ્કારની શ્રીમંતાઈ' કૃતિના સર્જક છે. - **કુન્દનિકા કાપડિયા**

556. 'અડધે રસ્તે' કૃતિનો સાહિત્ય પ્રકાર છે ? - **આત્મકથા**

557. ઝવેરચંદ મેઘાણીના છેલ્લો કટોરો કાવ્યને ક્યા પ્રકારનું કાવ્ય કહી શકાય ? - **દેશભક્તિનું કાવ્ય**

558. 'કંકાવટી' કૃતિના સર્જક જણાવો. - **ઝવેરચંદ મેઘાણી**

559. ઉમાશંકર જોશી સંસદના ક્યા ગૃહના સભ્ય હતા ? - **રાજ્યસભા**

560. 'સાકરનો શોધનારો' કૃતિના સર્જક જણાવો. - **યશવંતરાય પંડ્યા**

561. નરસૈયો ભક્ત હરિનો કૃતિનો સાહિત્યિક પ્રકાર પસંદ કરો. - **ચારિત્રાત્મક રચના**

562. 'હયાતી'ના રચયિતા છે. - **હરીન્દ્ર દવે**

563. દર્શકનું પૂરું નામ જણાવો. - **મનુભાઈ રાજારામ પંચોળી**

564. ઝવેરચંદ મેઘાણી નામ ક્યા ક્ષેત્રે આગળ છે ?- **લોકસાહિત્યના સંશોધક**

565. સ્વૈરવિહારી કોનું ઉપનામ છે ? - **રામનારાયણ વિશ્વનાથ પાઠક**

566. આગંતુક ક્યા વ્યક્તિ દ્વારા રચિત છે ? - **ધીરુબહેન પટેલ**

567. નાયક વિનાની નવલકથા કોને કહેવાય છે ? - **સોરઠ તારા વહેતા પાણી**

568. વિતાન સુદ બીજ કૃતિ સાથે ક્યા સાહિત્યકાર સંબંધિત છે ? - **રમેશ પારેખ**

569. ઝવેરચંદ મેઘાણીને મહાત્મા ગાંધીજી તરફથી મળેલું બિરુદ ક્યું છે ? - **રાષ્ટ્રીય શાયર**

570. વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો. - **ધોરાજી**

571. ગુજરાતમાં સાહિત્યના પિતા તરીકે કોણ જાણીતું છે ? - **નરસિંહ મહેતા**

572. સાહિત્યકાર નિરંજન ભગતની કૃતિનું નામ જણાવો. - **કિન્નરી**

573. રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. - **ચુનીલાલ મડિયા**

574. 'વ્યામોહ જવનીકા' ક્યા સાહિત્યકારની કૃતિ છે ? - **મગનભાઈ બી. પટેલ**

575. કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. - **તેજરેખા**

576. કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. - **ફૂલ ફાગણના**

577. પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. **સ્વાભિમાનના તીર્થસ્થાનો**

578. સાધુજીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વમી આનંદનું જન્મસ્થળ જણાવો. - **શિયાણી**

579. સમર્થ સાક્ષર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - **વિચારમાધુરી**

580. ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - **મહાપ્રસ્થાન**

581. કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. - **મોરબી**

582. વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. - **આગંતુક**

583. કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો. - **વડાલી**

584. સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો. - **આંતરયાત્રા**

585. 'સાપના ભારા' એકાંકી સંગ્રહના સર્જક કોણ ? - **ઉમાશંકર જોશી**

586. 'છપ્પા' સાથે ક્યા કવિનું નામ જોડાયેલું છે ? - **અખો**

587. 'કાશ્મીરનો પ્રવાસ' ગ્રંથના લેખક કોણ છે ? - **કલાપી**

588. ચંદ્રકાન્ત શેઠનું ઉપનામ જણાવો. - **નંદ સામવેદી**

589. ક્યા સાહિત્યકારને સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે ઓળખાય છે? - **નરસિંહરાવ દિવેટિયા**

590. ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ પામનાર કવિ દલપતરામનો જન્મ ક્યા થયો હતો ? - **વઢવાણ**

591. ક્યો કાવ્ય પ્રકાર ફારસી છે ? - **ગઝલ**

592. ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે? - **નરસિંહ મહેતા**

593. મનુભાઈ પંચોળીનું પૂરું નામ જણાવો. - **મનુભાઈ રાજારામ પંચોળી**

594. ક્યા લેખકે 'બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી તરીકે કામગીરી કરી હતી? - **ગગનવિહારી મહેતા**

595. કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. - **નિર્ઝરિણી**

596. નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. - **રાજકોટ**

597. 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. - **ચુનીલાલ મડિયા**

598. સૉનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? - **ચૌદ**

599. 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? - **નરસિંહ મહેતા**

600. 'હાઈકુ' કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો ? - **સ્નેહરશ્મિ**

601. સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો.- **કમળના તંતુ**

602. 'આશાભરી' ક્યા સાહિત્યકારની કૃતિ છે ? - **પિતામ્બર પટેલ**

603. 'પંચીકરણ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? - **અખો**

604. વેવિશાળ કૃતિના સર્જક કોણ છે ? - **ઝવેરચંદ મેઘાણી**

605. સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો. - **ઈર્શાદ**

606. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન પટેલની કઈ નવલકથા અન્વયે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયો છે ? - **આગંતુક**

607. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. - **ધંધુકા**

608. કવિવર ઉમાશંકર જોશીના કાવ્યસંગ્રહો ગંગોત્રી, નીશિથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયા છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. - **સમગ્ર કવિતા**

609. 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. - **સુરસિંહજી ગોહિલ**

610. 'મારી નાની-મોટી નિર્બળતાઓ જોઈ હું હતાશ નહિં બનું. બીજાઓ કરતા ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહિં કરું' - આ વિધાન કોનું છે ? - **મકરંદ દવે**

611. વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ જે તે વ્યક્તિની ....ઉપર આધાર રાખે છે. - **પહેલી છાપ**

612. વૈજ્ઞાનિક યુગમાં જ્ઞાતિ ઉત્પત્તિના ક્યા મતને સ્વીકારી શકાય તેમ નથી ? - **પરંપરાગત મત**

613. સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - **ઉપક્રમ**

614. સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો. - **મહુવા**

615. પ્રસિદ્ધ કવિ મુકુન્દરાય પારાશર્યનું જન્મસ્થળ જણાવો. - **મોરબી**

616. ભક્તકવિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચના જણાવો. - **હાર**

617. બ.ક. ઠાકોરે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ક્યું સોનેટ રચ્યું ? - **ભણકારો**

618. 'ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે' આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો. - **દયારામ**

619. ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો. - **યાયાવરી**

620. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? - **ગોવર્ધનરામ ત્રિપાઠી**

621. કવિવર ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. - **ઉમાશંકર જેઠાલાલ જોષી**

622. સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્ચાદભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે ? - **પ્રવાલદ્વિપ**

623. ડૉ.એલ.પી.તેસ્સિતોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું ? - **જૂની પશ્ચિમી રાજસ્થાની**

624. 'ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન'ના લેખક કોણ છે ? - **પ્રબોધ પંડિત**

625. 'કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. - **અખો**

626. પ્રસિદ્ધ કવિ મણિલાલ નભુભાઈનું જન્મ સ્થળ જણાવો. - **નડિયાદ**

627. 'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો. - **મીરાંબાઈ**

628. કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની છે ? - **દાણલીલા, સુદામાચરિત્ર, પુત્રવિવાહ**

629. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા ? - **ઈચ્છારામ સૂ. દેસાઈ**

630. 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. - **નારાયણ દેસાઈ**

631. કવિ નર્મદનું જન્મ સ્થળ જણાવો. - **સુરત**

632. 'માનચતુર અને ધર્મલક્ષ્મી'એ કઈ નવલકથાનો અંશ છે ? - **સરસ્વતીચંદ્ર**

633. ક્યા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે ? - **દયારામ**

634. રેતીની રોટલી ક્યા લેખકે આપેલી કૃતિ છે ? - **જ્યોતિન્દ્ર દવે**

635. રતિલાલ બોરિસાગરની કૃતિનું નામ જણાવો. - **સંભવામિ યુગે યુગે**

636. ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો ? - **કાંત**

637. ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મ સ્થળ જણાવો. - **ગોંડલ**

638. સાહિત્યકાર ચુનિલાલ મડિયાની રચનાનું નામ જણાવો. - **વેળા વેળાની છાંયડી**

639. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળુ રે બોલ વાલમના. આ પંક્તિ કોની છે ? - **મણિલાલ દેસાઈ**

640. 'છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ'- પંક્તિના કવિ કોણ છે? - **ઝવેરચંદ મેઘાણી**

641. ગુજરાતી સાહિત્યનું અમરપાત્ર 'મુંજ' કઈ નવલકથાનું પાત્ર છે? - **પૃથિવી વલ્લભ**

642. 'નાછૂટકે' ક્યા સાહિત્યકારની કૃતિ છે? - **પન્નાલાલ નાનાલાલ પટેલ**

643. પ્રથમ ગુજરાતી નવલકથા 'કરણઘેલો'ના લેખકનું નામ શું છે? - **નંદશંકર મહેતા**

644. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્વારા થાય છે? - **સુરેશ જોષી**

645. પ્રખર સાહિત્યકાર પન્નાલાલ પટેલનું જન્મ સ્થળ જણાવો. - **માંડલી**

646. બ્રહ્મદેશનો પ્રવાસ ક્યા લેખકની કૃતિ છે? - **કાકા કાલેલકર**

647. પ્રસિદ્ધ પ્રાર્થના 'મંગલ મંદિર ખોલો, દયામય'ના રચયિતાનું નામ જણાવો. - **નરસિંહરાવ દિવેટિયા**

648. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો. - **વડોદરા**

649. અમેરિકાના ગુજરાતીઓ માટે પ્રગટ થતું લોકપ્રિય સાપ્તાહિક 'ગુજરાત ટાઈમ્સ' સાથે સંકળાયેલ પત્રકાર શ્રી રમેશ તન્નાને કઈ પૂર્તિના સંપાદનની જવાબદારી સોંપવામાં આવી છે? - **સપ્તક**

649. 'કથ્યુ કથે તે શાનો કવિ' એ ઉક્તિના રચયિતાનું નામ જણાવો. - **શામળ**

650. પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ આનંદશંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. - **અમદાવાદ**

651. ગુજરાતી સાહિત્યમાં 'પ્રસાન્નિકા જ્ઞાનકોશ'ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે? - **બંસીધર શુક્લ**

652. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849ની 2જી મેના દિવસે વરતમાન નામનું છાપુ પ્રગટ થયું તેનું બીજું નામ શું હતું? - **બુધવારિયું**

653. દ્વિરેફની વાતો કોના દ્વારા રચિત છે? - **રામનારાયણ વિ. પાઠક**

654. મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. - **રણયજ્ઞ**

655. 'સત્યમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે? - **શાંતિલાલ શાહ**

656. 'નરસિંહ રા માયરા' કૃતિના રચયિતાનું નામ જણાવો. - **મીરાંબાઈ**

657. 'મળેલા જીવ' નવલકથાની શરૂઆત ક્યા મેળાથી થાય છે? - **જન્માષ્ટમીનો મેળો**

658. 'હાજી કાસમ તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે? - **આગબોટ**

659. આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા? - **ભિક્ષુ અખંડાનંદ**

660. ગુજરાતી નાટકના પિતા તરીકે કોને બિરુદ અપાયું છે? - **રણછોડભાઈ ઉદયરામને**

661. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? - **રણજિતરામ વાવાભાઈ**

662. ગુજરાત સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મ સ્થળ જણાવો. - **સુરત**

663. કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં 'વડોદરા સાહિત્ય સભા' તરીકે ઓળખાતી? - **પ્રેમાનંદ સાહિત્ય સભા**

664. ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. - **શબ્દસૃષ્ટિ**

665. ઉત્તર ગુજરાતમાં ચોટીયા ગામે જન્મેલા કલાક્ષેત્રે મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ છે? - **બંસીલાલ વર્મા**

666. 'નીરખીને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે'- આ કવિતાના રચયિતાનું નામ જણાવો. - **નરસિંહ મહેતા**

667. 'આ નભ ઝુક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા' આ પંક્તિના કવિ કોણ છે? - **પ્રિયકાન્ત મણિયાર**

668. 'કથા સુણી-સુણી ફુટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન' આ રચનાનો સાહિત્ય પ્રકાર ક્યો છે? - **છપ્પો**

669. મુક્તક એટલે શું? - **એક શ્લોકનું લઘુકાવ્ય**

670. 'આંધળો સસરોને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ' પંક્તિ કોણે આપી છે? - **અખો**

671. 'મેં એક બિલાડી પાળી છે.' બાળકાવ્ય ક્યા કવિ પાસેથી મળ્યું છે? - **ત્રિભુવન વ્યાસ**

672. 'આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો રે.' પંક્તિનો સાહિત્યપ્રકાર જણાવો. - **લોકગીત**

673. કાનજી અને જીવી કવિની નવલકથાના મુખ્ય પાત્રો છે? - **મળેલા જીવ**

674. કવિ 'અખો'નું મૂળનામ જણાવો. - **અક્ષયદાસ**

675. આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. - **તળાજા**

676. કુસુદ કઈ નવલકથાની કથા નાયિકા છે? - **સરસ્વતીચંદ્ર**

677. ક.મા.મુનશીનું તખલ્લુસ જણાવો. - **ઘનશ્યામ**

678. ક્યા લેખકે વિશ્વશાંતિ, ગંગોત્રી પ્રાચીના વગેરે કાવ્ય સંગ્રહો રચેલ છે? - **ઉમાશંકર જોશી**

679. આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. - **તિમિરપંથી-ધ્રુવ ભટ્ટ, વાદ-ઈલા આરબ મહેતા, વિજય બાહુબલી-રઘુવીર ચૌધરી, બદલાતા સરનામા-ચીનુ મોદી**

680. નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. - **મીરાંની રહી મહેક**

681. 'મરી જવાની મજા', 'અકસ્માત' જેવી કૃતિઓ કોણે આપી છે? - **લાભશંકર ઠાકર**

ભારતીય બંધારણ

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
   A) આસામ B) નાગાલેન્ડ
   C) હિમાચલ પ્રદેશ D) ઝારખંડ
2. સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.
   A) Voter's Verification Paper Audit Trail
   B) Voter Verifiable Paper Audit Trail
   C) Voter Verification Paper Audit Trail
   D) Voter Verifiable Paper's Audit Trail
3. ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ?
   A) 1987 B) 1988 C) 1986 D) 1989
4. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?
   A) મુખ્ય પ્રધાન B) સ્પીકર
   C) સંસદીય સચિવ D) મુખ્ય સચિવ શ્રી
5. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?
   A) એટર્ની જનરલ B) લોકસભાના સભાપતિ
   C) ભારતના મુખ્ય ન્યાયાધીશ D) મુખ્ય ચૂંટણી અધિકારી
6. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?
   A) રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
   B) વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
   C) જલીયાંવાલા બાગના લોહ સ્તંભમાંથી
   D) જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી

રેવન્યૂ તલાટી - 28/02/2016

7. નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?
   A) રાજેન્દ્રપ્રસાદ B) નીલમ સંજીવ રેડ્ડી
   C) વી.વી. ગીરી D) જ્ઞાની ઝૈલસિંહ
8. તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
   A) સરોજીની નાયડુ B) સરદાર વલ્લભભાઈ પટેલ
   C) જવાહરલાલ નેહરુ D) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
9. ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?
   A) શોષણ સામેનો અધિકાર B) સમાનતાનો અધિકાર
   C) બંધારણીય ઉપાયનો અધિકાર D) સ્વાતંત્ર્યતાનો અધિકાર

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

10. લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?
    A) 85 લાખ B) 70 લાખ C) 75 લાખ D) 80 લાખ

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

11. રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ?
    A) કાયદામંત્રી B) રાજ્યપાલ C) અધ્યક્ષ D) મુખ્યપ્રધાન
12. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?
    A) લોકસભાના સ્પીકર B) ઉપરાષ્ટ્રપતિ
    C) વડાપ્રધાન D) રાષ્ટ્રપતિ
13. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?
    A) 510 કરતાં વધુ નહીં B) 530 કરતા વધુ નહી
    C) 520 કરતાં વધુ નહી D) 515 કરતા વધુ નહી
14. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?
    A) ગ્રામ અદાલત B) ગ્રાહક અદાલત
    C) ખાપ પંચાયત D) લોક અદાલત
15. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?
    A) ગૃહપ્રધાન B) રાષ્ટ્રપતિ C) સેના પ્રમુખ D) વડાપ્રધાન

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

16. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ?
    A) 1975 B) 1977 C) 1947 D) 1951

1)D, 2)B, 3)D, 4)B, 5)C, 6)B, 7)C, 8)C, 9)B, 10)B, 11)C, 12)D, 13)B, 14)D, 15)B, 16)A.

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

17. રાષ્ટ્રગીત 'જન ગણ મન'ના કવિ કોણ ?
A)ઝવેરચંદ મેઘાણી B)હરિવંશરાય બચ્ચન
C)બંકિમચંદ્ર D)રવીન્દ્રનાથ ટાગોર

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

18. ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ?
A)13 B)105 C)194 D)25 થી 28

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

19. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ કયું છે ?
A)પંચાયત B)ન્યાય તંત્ર C)વહીવટી તંત્ર D) સૈન્ય

20. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?
A)સમાનતાઓ અધિકાર B)ધાર્મિક સ્વતંત્રતાઓ અધિકાર
C)માહિતીનો અધિકાર D)બંધારણીય ઈલાજોનો અધિકાર

21. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?
A)ડૉ.બી.આર. આંબેડકર B)ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
C)જવારલાલ નેહરુ D)મૌલાના આઝાદ

22. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ?
A)14 B)21 C)11 D)7

23. સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ?
A)Central Auditor General
B)Chief Auditor General
C)Comptroller and Auditor General
D)Controller Of Accounts General

GPSC પેપર - 1 - 2017

24. બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે?
A)ત્રીજી અનુસૂચિ B)દશમી અનુસૂચિ
C)પાંચમી અનુસૂચિ D)નવમી અનુસૂચિ

25. 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
A)જસ્ટિસ હરિલાલ જે. કાનિયા B)જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર
C)નાથપાઈ D)એલ.એમ. સિંઘવી

26. ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ?
A)4844 B)2414 C)908 D)708

27. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
A)ગૃહમંત્રી B)પી.એમ.ઓ.
C)કેબિનેટ મંત્રાલય
D)પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લીક ગ્રીવન્સ

28. સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્‌ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય .... ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.
A)6 મહિના B)1 વર્ષ C)3 મહિના D)2 મહિના

29. ભારતના બંધારણનો અનુચ્છેદ 1 (1) કહે છે
A)અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.
B)ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે
C)બંધારણના આરંભે નાગરિકત્વ
D)રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં

30. ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?
A)અનુચ્છેદ - 245 - 255 B)અનુચ્છેદ - 256 - 263
C)અનુચ્છેદ - 264 - 268A D)અનુચ્છેદ - 269 - 279

31. કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?
A)વડાપ્રધાન B)ગૃહમંત્રી
C)ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ D)લોકસભાના વિરોધપક્ષના નેતા

32. સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
A)મુરલી મનહર જોશી B)ઈ.એમ.એસ. નચીએપ્પન
C)પી. ચિદમ્બરમ D)એન. ચંદ્રાબાબુ નાયડુ

33. નીચેની પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.
1) શૂન્યકાળ (Zero Hour)
2) પ્રશ્નોત્તરીકાળ (Question Hour)
3) ગૃહની કાર્યસૂચિ (Agenda of the House)
A)1, 2, 3 B)2, 3, 1 C)2, 1, 3 D)1, 3, 2

17)D, 18)B, 19)B, 20)C, 21)B, 22)A, 23)C, 24)C, 25)D, 26)D, 27)D, 28)D, 29)B, 30)B, 31)C, 32)B, 33)C.

34. કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શકય બનાવી ?

A)પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ

B)છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ

C)સાતમો બંધારણીય સુધારા અધિનિયમ

D)આઠમો બંધારણીય સુધારા અધિનિયમ

35. સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

A)અનુચ્છેદ 41 B) અનુચ્છેદ 42

C)અનુચ્છેદ 43 D) અનુચ્છેદ 44

36. નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

A)દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)

B)બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)

C)વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)

D)ઉપરના પૈકી કોઈ નહીં

37. ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

A)સંસદની જાહેર હિસાબ સમિતિ

B)એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં

C)વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ

D)કેન્દ્રીય તકેદારી આયોગ

38. ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?

i) સત્તાવાર ભાષાનો વિભાગ

ii) રાજ્યનો વિભાગ

iii) જમ્મુ અને કાશ્મિરની બાબતોનો વિભાગ

iv) સીમા સંચાલનનો વિભાગ

A)i, ii અને iii B)ii, iii અને iv

C)iii અને iv D)i, ii, iii અને iv

GPSC પેપર - 2 - 2017

39. ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

A)અનુચ્છેદ 47 A B) અનુચ્છેદ 48 A

C)અનુચ્છેદ 49 A D)અનુચ્છેદ 50 A

GPSC MAINS પેપર - 1 - 2016

40. ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

A)જયપ્રકાશ નારાયણ B)વિનોબા ભાવે

C)મહાત્મા ગાંધી D)દયાનંદ સરસ્વતી

41. લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ?

A)રાષ્ટ્રપ્રમુખ B)વડાપ્રધાન

C)અધ્યક્ષ D)વિરોધપક્ષના નેતા

42. રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) કયા વિષયની યાદીમાં આવે છે ?

A)સંઘ યાદી B)રાજ્ય યાદી

C)સમવર્તી યાદી D)અન્ય યાદી

43. નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છેકે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે?

A) 109(1) B) 109(2) C) 109(3) D) 107(1)

44. ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

A)અનુચ્છેદ-163(1-અ) B)અનુચ્છેદ-164(1-અ)

C)અનુચ્છેદ-165(1-અ) D)અનુચ્છેદ-166(1-અ)

45. નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

A)બિહાર B)મહારાષ્ટ્ર

C)ઉત્તર પ્રદેશ D)પશ્ચિમ બંગાળ

46. અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભીકરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ?

A)અનુચ્છેદ 310 B)અનુચ્છેદ 311

C)અનુચ્છેદ 312 D)અનુચ્છેદ 315

47. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે?

A)અનુચ્છેદ-365 B)અનુચ્છેદ-360

C)અનુચ્છેદ-357 D)અનુચ્છેદ-352

48. એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

A)ચોથો સુધારો B)સાતમો સુધારો

C)અગિયારમો સુધારો D)ચોવીસમો સુધારો

49. નીચેના પૈકી કયું જોડકું સાચુ નથી ?

રીટ (Writ) આશય અથવા અર્થ

A)સર્શિઓરરી- ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે

B)ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા)

C)પ્રોહીબિશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છ

D)મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ)કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે

34)C, 35)D, 36)C, 37)C, 38)D, 39)B, 40)C, 41)C, 42)A, 43)A, 44)B, 45)C, 46)C, 47)A, 48)B, 49)C.

50. પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ?

A) 1999 B) 2004 C) 2009 D) 2014

51. જો એવો પ્રશ્ન ઉદ્‌ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ?

A) ભારતના રાષ્ટ્રપ્રમુખ B) ભારત સરકારના નાણામંત્રી

C) લોકસભાના અધ્યક્ષ D) રાજ્યસભાના અધ્યક્ષ

52. કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક'ની જોગવાઈ કરવામાં આવેલ છે?

A) અનુચ્છેદ-110 B) અનુચ્છેદ-112

C) અનુચ્છેદ-113 D) અનુચ્છેદ-114

53. એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ?

A) આર્થિક કાપ દરખાસ્ત B) નીતિ કાપ દરખાસ્ત

C) શાખ કાપ દરખાસ્ત D) સાંકેતિક કાપ દરખાસ્ત

54. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે ?

A) સંઘ યાદી B) રાજ્ય યાદી

C) સમવર્તી યાદી D) અન્ય યાદી

55. નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

A) અનુચ્છેદ-243A B) અનુચ્છેદ-243B

C) અનુચ્છેદ-243ZD D) અનુચ્છેદ-243ZE

56. નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

A) અનુચ્છેદ-308-323 B) અનુચ્છેદ-308-329

C) અનુચ્છેદ-348-351 D) અનુચ્છેદ-148-151

GPSC MAINS પેપર - 2 - 2016

57. નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ?

A) લોકલેખા સમિતિ B) અનુમાન સમિતિ

C) આયોજન સમિતિ D) નાગરિક સેવા સમિતિ

58. બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે?

A) કલમ 309 B) કલમ 310 C) કલમ 311 D) કલમ 312

59. નાગરિકો, ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ....

A) લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા

B) વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા

C) સ્થાનિક ભારતીય દુતાવાસ/કોન્સ્યુલેટ/હાઈકમીશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી

D) ઉપરના પૈકી કોઈ નહી

60. વીજળી ભારતીય સંવિધાનના ક્યા વૈધાનિક ભાગમાં આવે છે?

A) સંઘ યાદી B) રાજ્ય યાદી

C) સંયુક્ત યાદી

D) કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી

61. ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

A) ભારતના રાષ્ટ્રપતિ B) ભારતના પ્રધાનમંત્રી

C) ભારતના નાણાંમંત્રી

D) ભારતના નાણાં સચિવ (The Finance Secretary)

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

62. રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે?

A) અનુચ્છેદ-363 B) અનુચ્છેદ-363-ક

C) અનુચ્છેદ-364 D) અનુચ્છેદ-365

63. સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

A) અનુચ્છેદ-335 B) અનુચ્છેદ-334

C) અનુચ્છેદ-338(4) D) અનુચ્છેદ-338(9)

64. જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

A) અનુચ્છેદ-166 B) અનુચ્છેદ-167

C) અનુચ્છેદ-168 D) અનુચ્છેદ-177

65. ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

A) અનુચ્છેદ-51ક B) અનુચ્છેદ-39ક

C) અનુચ્છેદ-25 D) અનુચ્છેદ-48 ક

50)C, 51)C, 52)D, 53)B, 54)C, 55)C, 56)A, 57)A, 58)C, 59)C, 60)C, 61)A, 62)C, 63)D, 64)B, 65)D.

66. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના .... અનુચ્છેદમાં દર્શાવેલ છે.

A) 141 B) 126 C) 127 D) 124

67. કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

A) મુખ્ય ચૂંટણી કમિશનર B) ભારતના રાષ્ટ્રપતિ

C) સંસદ D) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

68. અ-યાદીને બ-યાદી સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.

અ	બ
A) સમાનતાનો હક	1) અનુચ્છેદ-25
B) શોષણ સામેનો હક	2) અનુચ્છેદ-14
C) સાંસ્કારિક અને શૈક્ષણિક હકો	3) અનુચ્છેદ-23
D) ધર્મ સ્વાતંત્ર્યનો હક	4) અનુચ્છેદ-29

A) a-2, b-3, c-1, d-4 B) a-2, b-3, c-4, d-1

C) a-3, b-2, c-4, d-1 D) a-1, b-3, c-2, d-4

69. સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ...... ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

A) સંસદ B) નાણા મંત્રી C) નાણા સચિવ D) રાષ્ટ્રપતિ

70. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

A) પરિશિષ્ટ-1 B) પરિશિષ્ટ-3 C) પરિશિષ્ટ-2 D) પરિશિષ્ટ-10

71. રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ?

A) કર્ણાટક B) મધ્ય પ્રદેશ C) ઓડિશા D) કેરળ

72. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?

A) માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી

B) વડાપ્રધાન

C) કેબિનેટ સચિવ D) સંસદ

73. ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ?

A) ભારતીય વહીવટી સેવા B) ભારતીય પોલીસ સેવા

C) ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા

D) ભારતીય વન સેવા

74. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ?

A) અનુચ્છેદ-52 B) અનુચ્છેદ-53

C) અનુચ્છેદ-54 D) અનુચ્છેદ-55

75. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

A) અનુચ્છેદ-340 B) અનુચ્છેદ-341

C) અનુચ્છેદ-337 D) અનુચ્છેદ-338

76. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ?

A) ઉચ્ચત્તમ ન્યાયાલય B) વડાપ્રધાન

C) રાષ્ટ્રપતિ

D) ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય

77. અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?

A) પહેલી B) ત્રીજી C) ચોથી D) પાંચમી

78. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે ?

A) રાજ્યપાલ B) રાષ્ટ્રપતિ C) વડાપ્રધાન D) સુપ્રીમ કોર્ટ

79. લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા....... થી વધુ ન હોવી જોઈએ.

A) 10 B) 16 C) 20 D) 18

PSI GK - 1/1/2017

80. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?

A) મુંબઈ B) કેરળ C) મદ્રાસ D) દિલ્હી

81. અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો.

A) હિન્દુઓ પુરતો સીમિત છે

B) ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી

C) હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પુરતો સીમિત છે

D) હિન્દુઓ અને મુસ્લિમો પુરતો સીમિત છે

PSI GK - 4-3/5-3/2017

82. ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી ક્યો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?

A) નેશ્નોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી B) ઑલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ

C) બહુજન સમાજ પાર્ટી D) સમાજવાદી પાર્ટી

83. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ?

A) 2 : 1 B) 3 : 2 C) 3 : 4 D) 5 : 3

84. ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ?

A) 395 B) 403 C) 417 D) 421

66)B, 67)A, 68)B, 69)D, 70)C, 71)A, 72)D, 73)C, 74)D, 75)A, 76)C, 77)D, 78)B, 79)C, 80)B, 81)B, 82)D, 83)B, 84)B.

કોન્સ્ટેબલ - 23/10/2016

85. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?
A)નેપાલી B)ગુજરાતી C)રાજસ્થાની D) સિંધી

86. ભારત દેશના બંધારણીય વડા છે -
A)ભારતના વડાપ્રધાન B)ભારતના રાષ્ટ્રપતિ
C)ભારતના મુખ્ય ન્યાયાધીશ D)ભારતના નાયબ વડાપ્રધાન

87. ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે?
A)વડાપ્રધાન
B)રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
C)ભારતની સંસદ
D)ભારતના રાષ્ટ્રપતિ

88. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?
A)પ્રથમ સુધારો (1951) B)પાંત્રીસમો સુધારો (1975)
C)બેતાલીસમો સુધારો (1976) D)ત્રેપનમો સુધારો (1986)

89. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?
A)ભારતીય પ્રશાસનિક સેવા B)ભારતીય પોલીસ સેવા
C)ભારતીય વન સેવા D)ભારતીય વિદેશ સેવા

90. ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?
A)અનુચ્છેદ 200 B)અનુચ્છેદ 300
C)અનુચ્છેદ 356 D)અનુચ્છેદ 370

91. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે -
A)25 વર્ષ B)30 વર્ષ
C)35 વર્ષ D)કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી

92. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?
A)અનુચ્છેદ 32 B)અનુચ્છેદ 226
C)અનુચ્છેદ 154 D)અનુચ્છેદ 201

93. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી.......
A)જરૂરી નથી B)તેના વકીલ માંગણી કરે તો જ.
C)ફરજીયાત છે D)પોલીસ અધિકારી ઈચ્છે તો જ.

કોન્સ્ટેબલ - 2015

94. ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
A)ડૉ.ભીમરાવ આંબેડકર B)સી.રાજગોપાલાચારી
C)રાજેન્દ્ર પ્રસાદ D)જવાહરલાલ નેહરુ

95. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?
A)અનુચ્છેદ-356 B)અનુચ્છેદ-302
C)અનુચ્છેદ-370 D)અનુચ્છેદ-360

96. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ?
A)રાષ્ટ્રપતિ B)રાજ્યપાલ
C)મુખ્યમંત્રી D)વિધાનસભા અધ્યક્ષ

97. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ?
A)60 વર્ષ B)62 વર્ષ C)65 વર્ષ D)68 વર્ષ

98. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
A)લોકસભા અને રાજ્યસભા
B)લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
C)લોકસભા D)રાજ્યસભા

બિન સચિવાલય કલાર્ક - 2016

99. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?
A) ભારતનાં એટર્ની જનરલ B) રાજ્યના ચીફ સેક્રેટરી
C) સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો D) રાજ્યના રાજ્યપાલો

100. વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?
A) મુખ્યમંત્રી કહે તો B) મંત્રીમંડલના હિતમાં
C) વિપક્ષના નેતા વિનંતી કરે તો D) સરખા મત થાય ત્યારે

101. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ.........
A) લોકસભાના અધ્યક્ષ બને છે.
B) રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
C) બંન્નેના અધ્યક્ષ બને છે.
D) (A)(B) અને (C) ત્રણેયમાંથી એકપણ નહી.

102. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
A) 1761 B) 1687 C) 1681 D) 1725

103. '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ?
A) ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
B) લશ્કરના જવાનો માટે
C) અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
D) લોકશાહીના રક્ષણ માટે

104. બંધારણની રીતે 'સગીર'શું દર્શાવે છે ?
A) બાળક B) વ્યક્તિ
C) અઢાર વર્ષની નીચેની ઉંમર
D) (a), (b) અને(c) ત્રણેયમાંથી એકપણ નહી.

105. નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?
A) રાષ્ટ્રપતિ B) પ્રધાનમંત્રી C) નાણાંમંત્રી D) સંસદ

85)C, 86)B, 87)D, 88)C, 89)D, 90)C, 91)C, 92)B, 93)C, 94)A, 95)C, 96)B, 97)C, 98)B, 99)B, 100)D, 101)B, 102)B, 103)C, 104)C, 105)A.

106. ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ?

A) 1988 B) 1993 C) 1990 D) 1989

107. રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

A) સંરક્ષણ બિલ B) નાણાંકીય બિલ

C) કાયદાકીય બિલ

D) (A),(B) અને (C) ત્રણેયમંથી એકપણ નહીં.

108. પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂંક કોણ કરે છે ?

A) હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ B) રાજ્ય સરકાર

C) સેશન્સ કોર્ટ D) જિલ્લા કલેક્ટર

109. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ?

A) રેલવે બજેટ B) સંરક્ષણ(ડિફેન્સ) બજેટ

C) વિદેશ નીતિ D) નાણાંકીય બિલ

110. રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

A) પ્રધાનમંત્રી B) એટર્ની જનરલ

C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ D) વડી અદાલતના ન્યાયમૂર્તિ

111. ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

A) મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949

B) ગુજરાત મહાનગરપાલિકા ધારો -1963

C) નગર આયોજન અને વિકાસ ધારો -1978

D) (A),(B) અને (C) ત્રણેય

112. સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ?

A) સ્પીકર B) ચેરમેન

C) (A) અને (B) બન્ને

D) (A),(B) અને (C) ત્રણેયમાંથી એકપણ નહી.

113. સંસદના ઉપલા ગૃહને .... કહે છે.

A) લોકસભા B) રાજ્યસભા

C) વિધાનસભા

D) (A),(B) અને (C) ત્રણેયમાંથી એકપણ નહી.

114. દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ....ને હોય છે.

A) રાષ્ટ્રપતિ B) સુપ્રિમ કોર્ટના જજને

C) પ્રધાનમંત્રી D) (A),(B) અને (C) ત્રણેયને

115. વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે?

A) મુખ્યમંત્રી B) રાજ્યપાલ

C) વિધાનસભાના અધ્યક્ષ D) રાષ્ટ્રપતિ

116. બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી?

A) અનુચ્છેદ 24 પ્રમાણે B) અનુચ્છેદ 21 પ્રમાણે

C) અનુચ્છેદ 26 પ્રમાણે D) આવી કોઈ જોગવાઈ નથી

117. 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

A) ગ્રામ સભા B) વોર્ડ સમિતિ

C) સામાજિક ન્યાય સમિતિ D) (A),(B) અને (C) ત્રણેય

118. ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી?

A) વિધાનસભાના અધ્યક્ષ B) રાજ્યપાલ

C) મુખ્યમંત્રી D) નાયબ મુખ્યમંત્રી

119. ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી?

A) ટી.એન.સત્યપંથી B) આર.કે.સુબ્રમણ્યમ

C) એન.ગોપાલાસ્વામી આયંગર D) એસ.ચેન્નારેડ્ડી

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

120. 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ?

A) અનુચ્છેદ - 12 B) અનુચ્છેદ - 14

C) અનુચ્છેદ - 16 D) અનુચ્છેદ - 18

121. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ?

A) ઉંમર B) ધર્મ C) શિક્ષણ D) હોદ્દો

122. ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે?

A) કઠોરોપનિષદ B) મૂંડકોપનિષદ C) ઋગ્વેદ D) સામવેદ

123. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

A) હરિલાલ કણિયા B) પી. એન. પટેલ

C) ચીમનાલાલ વાણિયા D) એન. એસ. ઠક્કર

124. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

A) રાષ્ટ્રપતિ

B) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

C) રાજ્યના મુખ્યમંત્રી

D) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)

125. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?

A) અનુચ્છેદ - 309 B) અનુચ્છેદ - 311

C) અનુચ્છેદ - 312 D) અનુચ્છેદ - 310

126. રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?

A) રાજ્યપાલ તેઓને નીમે છે.

B) રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.

C) રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.

D) ગૃહમાં તેઓ મત આપી શકે છે.

106)B, 107)D, 108)B, 109)D, 110)C, 111)A, 112)C, 113)B, 114)A, 115)B, 116)A, 117)B, 118)D, 119)C, 120)B, 121)A, 122)B, 123)A, 124)B, 125)B, 126)D.

127. 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો ક્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?
A)લોકમાન્ય તિલક B)મહાદેવ ગોવિંદ રાનડે
C)મહાત્મા ગાંધી D)ગોપાલકૃષ્ણ ગોખલે

128. રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
A)27 વર્ષ B)35 વર્ષ C)40 વર્ષ D)50 વર્ષ

129. ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?
A)બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
B)બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ
C)બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો
D)બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

130. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?
A)લક્ષ્મીમલ સિંઘવી B)મહાત્મા ગાંધી
C)બાબાસાહેબ આંબેડકર D)જયપ્રકાશ નારાયણ

131. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ?
A)કલમ - 320 B)કલમ 322
C)કલમ - 324 D)કલમ - 326

132. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ .... હતા.
A)કનૈયાલાલ મુનશી B)ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C)સરોજીની નાયડુ D)સી. રાજગોપાલાચારી

133. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?
A)એટર્ની જનરલ B)સોલિસિટર જનરલ
C)સ્પીકર D)સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ

134. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે?
A)નવ અઠવાડિયામાં B)ત્રણ અઠવાડિયામાં
C)બે અઠવાડિયામાં D)છ અઠવાડિયામાં

135. ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા ક્યા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
A)51-ક B)42 C)44 D)25

136. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે?
A)રાજયપાલ B)મુખ્યપ્રધાન C)વડાપ્રધાન D)રાષ્ટ્રપતિ

137. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે?
A)20 B)21 C)25 D)23

138. સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે?
A)રાષ્ટ્રપતિ B)વડાપ્રધાન
C)નાણાંપ્રધાન D)કેન્દ્રીય નાંણાં પંચ

139. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
A)રાષ્ટ્રીય પક્ષી - મોર B)રાષ્ટ્રીય પ્રાણી - સિંહ
C)રાષ્ટ્રીય ફૂલ - કમળ D)રાષ્ટ્રીય ફળ - કેરી

140. ભારતની બંધારણ સભા દ્વારા તા. .... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.
A)26 જાન્યુઆરી, 1949 B)15 ઓગસ્ટ, 1949
C)26 નવેમ્બર, 1949 D)26 જાન્યુઆરી, 1950

141. સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?
A)અનુચ્છેદ - 45 B)અનુચ્છેદ - 44
C)અનુચ્છેદ - 16 D)અનુચ્છેદ - 14

142. બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો.........
A)એક વિભક્ત ભાગ છે. B)એક અતૂટ ભાગ છે.
C)એક શ્રેષ્ઠ ભાગ છે. D)એક સંદિગ્ધ ભાગ છે.

143. નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે?
A)બ્રિટન (યુ.કે.) B)યુ.એસ.એ.
C)રશિયા D)ભારત

144. અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે?
A)નાણાં ખાતું B)નાણાં પંચ
C)નાણાં પ્રધાન D)અંદાજપત્ર શાખા

145. ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?
A)કેન્દ્ર / સંઘ યાદી B)રાજ્ય યાદી
C)સહવર્તી / સમવર્તી યાદી D)નાગરિકતા યાદી

146. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી?
A)સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
B)મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે.
C)આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
D)આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.

147. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?
A)અનુસૂચિ - 2 B)અનુસૂચિ - 1
C)અનુસૂચિ - 3 D)અનુસૂચિ - 5

148. ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું?
A)સ્પીકર B)રાજયસભાના સભ્ય
C)ઉદ્યોગ મંત્રીશ્રી D)સંસદીય સચિવ

149. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...
A)દીવાની અધિકાર છે B)મૂળભૂત ફરજ છે
C)રાજકીય અધિકાર છે D)મૂળભૂત અધિકાર છે

127)C, 128)B, 129)C, 130)A, 131)C, 132)B, 133)D, 134)D, 135)A, 136)D, 137)C, 138)A, 139)B, 140)C, 141)B, 142)B, 143)D, 144)C, 145)A, 146)D, 147)B, 148)A, 149)C.

150. ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?
A) સંસદ સર્વોચ્ચ છે B) ન્યાયપાલિકા સર્વોચ્ચ છે
C) સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે
D) કારોબારી સર્વોચ્ચ છે

151. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
A) નાણાંકીય પ્રસ્તાવ B) નાણાંકીય નિવેદન
C) નાણાંકીય આવેદનપત્ર D) નાણાંકીય અરજી

152. રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા ઍંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે?
A) 05 B) 12 C) 10 D) 02

153. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે?
A) હેબિયસ કોર્પસ B) સર્ટિઓરરી C) મેન્ડેમસ
D) કો-વોરન્ટો

154. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?
A) 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો
B) 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
C) 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો
D) 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો

155. ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?
A) દેશના શાસનમાં પાયાગત છે.
B) રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
C) આ સિદ્ધાંતોનો અમલ કોર્ટ વડે કરાવી શકાય.
D) આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

GPSC પ્રિલિમ - 2001

156. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?
A) ભારતના નાગરિક હોવા જોઈએ
B) સરકારી કર્મચારી હોવો જોઈએ
C) 35 વર્ષથી વધુ ઉંમર હોય D) સંસદ સભ્ય ન હોય

GPSC પ્રિલિમ - 2007

157. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?
A) 24 B) 26 C) 28 D) 22

158. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
A) ડૉ. રાધાકૃષ્ણન B) ચક્રવર્તી રાજગોપાલાચારી
C) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ D) આમાંના કોઈ નહીં

159. ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય ?
A) ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
B) ઉમેદવારોની આખરી યાદી બહાર પડ્યાની તારીખથી
C) મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
D) જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી

160. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?
A) ચૂંટાયેલા ધારાસભ્યો B) અગ્રણી નાગરિકો
C) મંત્રીઓ D) વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ

161. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ?
A) 22 B) 19 C) 25 D) 18

162. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ?
A) કોઈ નિર્ધારિત મુદત નથી B) ચાર વર્ષ
C) પાંચ વર્ષ D) સાત વર્ષ

163. PIL શું છે ?
A) પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ B) પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો
C) પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ D) પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

GPSC પ્રિલિમ - 2014

164. આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી?
A) 15મી ઓગસ્ટ, 1949 B) 26મી જાન્યુઆરી, 1949
C) 26મી જાન્યુઆરી, 1950 D) 26મી નવેમ્બર, 1949

165. બંધારણના અનુચ્છેદ-51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ?
A) સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની
B) જાહેર મિલકતનું રક્ષણ કરવાની
C) બંધારણને વફાદાર રહેવાની
D) બિનસાંપ્રદાયિકતા જાળવવાની

166. સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?
A) ભારતનું ચૂંટણી પંચ B) ભારતના વડાપ્રધાન
C) ભારતના રાષ્ટ્રપતિ D) ભારતની સર્વોચ્ચ અદાલત

167. 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય' ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?
A) અનુચ્છેદ - 19(1)(A) B) અનુચ્છેદ - 19(1)(B)
C) અનુચ્છેદ - 19(1)(C) D) અનુચ્છેદ - 19(1)(D)

168. ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ?
A) વડાપ્રધાન B) મંત્રીઓ C) રાષ્ટ્રપતિ D) ઉપરાષ્ટ્રપતિ

169. રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?
A) 1/8 B) 1/10 C) 1/2 D) 1/4

150)C, 151)B, 152)D, 153)A, 154)B, 155)C, 156)B, 157)B, 158)C, 159)D, 160)A, 161)B, 162)C, 163)D, 164)D, 165)D, 166)A, 167)B, 168)C, 169)B.

170. બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?
A) કલમ - 41 B) કલમ - 24
C) બંધારણમાં જોગવાઈ નથી D) કલમ - 51-એ

171. બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં ક્યા રાજ્યમાં થયો હતો ?
A) કેરળ B) મુંબઈ
C) જમ્મુ-કાશ્મીર D) ઉત્તર પ્રદેશ

172. એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ?
A) પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.
B) સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે.
C) લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે.
D) રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્વ ધરાવે છે.

173. ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?
A) વડાપ્રધાનને B) સર્વોચ્ચ ન્યાયાલયને
C) સંસદને D) રાષ્ટ્રપતિને

174. 'જનગણમન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે .... તરીકે પ્રસિદ્ધ કરેલ.
A) ભારત ભાગ્યવિધાતા B) આમાર સોનાર બંગલા
C) જનગણમન D) વંદેમાતરમ્

175. 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ?
A) મોરારજી દેસાઈ B) યશવંતરાવ ચૌહાણ
C) લાલબહાદુર શાસ્ત્રી D) ફઝલઅલી

PSI ખાતાકીય - 23/04/2017

176. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?
A) મુખ્ય પ્રધાન B) સ્પીકર
C) સંસદીય સચિવ D) મુખ્ય સ્પીકરશ્રી

177. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યું છે ?
A) ડોલ્ફીન B) શાર્ક C) મગર D) વ્હેલ

178. નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ?
A) 33 % B) 16.5 %
C) 50 % D) કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યુ નથી

179. રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ?
A) સંસદ B) રાજ્યસભાના સભ્યો
C) ઉપરાષ્ટ્રપતિ D) વડાપ્રધાન

180. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?
A) કેન્દ્ર સરકાર B) રાષ્ટ્રપતિ
C) રાજ્ય સરકાર D) રાજ્યપાલ

181. વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?
A) રાજ્યપાલ B) મુખ્યમંત્રી
C) વિધાનસભાના સ્પીકર D) લોકસભાના સ્પીકર

182. ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
A) ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
B) ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
C) ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.
D) ઉપરોક્ત ત્રણેય વિધાન લાગુ પડતા નથી.

183. કોઈપણ વ્યક્તિઓ ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના ક્યા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે?
A) બંધારણીય ઉપચારોનો અધિકારો
B) શોષણ વિરુદ્ધનો અધિકાર
C) સ્વતંત્રતાનો અધિકાર
D) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર

184. ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?
A) રાષ્ટ્રપતિ B) વડાપ્રધાન
C) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ D) શપથવિધિ થતી નથી

185. ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General Of india)ની નિમણૂક કોણ કરે છે ?
A) પ્રધાનમંત્રી B) કેન્દ્રીય નાણાં મંત્રી
C) પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
D) રાષ્ટ્રપતિ

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

186. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ-પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે?
A) અનુચ્છેદ - 57 (બ) B) અનુચ્છેદ - 50 (ક)
C) અનુચ્છેદ - 51 (ક) D) અનુચ્છેદ - 47 (ડ)

187. ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે?
A) વડાપ્રધાન B) જનરલ
C) રાષ્ટ્રપતિ D) સંરક્ષણ પ્રધાન

170)B, 171)A, 172)A, 173)B, 174)A, 175)D, 176)B, 177)A, 178)C, 179)D, 180)B, 181)C, 182)A, 183)C, 184)D, 185)D, 186)C, 187)C.

PSI/ASI GK - 2/5/2015

188. રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.
A)સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ B)વડાપ્રધાન
C)ઉપરાષ્ટ્રપતિ D)લોકસભાના સ્પીકર

189. ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?
A)જન્મથી કે વારસાથી B)નોંધણીથી કે લગ્નથી
C)કાયદા દ્વારા દેશીકરણથી D)ઉપરના તમામથી

190. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
A)25 વર્ષ B)20 વર્ષ C)18 વર્ષ D)35 વર્ષ

GPSC Class-1 - 2016

191. કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
A)17 B)23 C)32 D)36

192. અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ?
A)3 B)4 C)5 D)6

193. એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?
A)રાષ્ટ્રપતિની મરજી હોય ત્યા સુધી
B)પાંચ વર્ષ
C)છ વર્ષ D)ત્રણ વર્ષ

194. મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?
A)ફક્ત સર્વોચ્ચ અદાલત B)ફક્ત વડી અદાલત
C)સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
D)કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

195. લોકસભામાં જો બજેટ ના મંજુર થાય તો.
A)જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજુ કરવામાં આવે છે
B)મંજુરસ અર્થ રાજય સભાને મોકલવામાં આવે છે.
C)નાણામંત્રી રાજીનામું આપે છે
D)વડા પ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે

196. ભારતનાં બંધારણમાં 42 મો સુધારો કયારથી અમલી બનેલ છે?
A)તા. 13 જાન્યુઆરી 1977 B)તા. 3 જાન્યુઆરી 1977
C)તા. 23 જાન્યુઆરી 1977 D)તા. 1 જાન્યુઆરી 1977

197. "ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજય ભેદભાવ કરી શકશે નહી."
આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
A)16 B)15 C)16 D)17

198. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજયની ફરજ છે.
આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
A)36 B)37 C)38 D)39

199. "રાજયસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુકતી કરી શકે છે."
આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
A)76 B)77 C)79 D)80

200. રાજયની કારોબારી સત્તા (Executive Power) કોનામાં નિહિત થાય છે?
A)માન.રાષ્ટ્રપતિશ્રી B)માન.રાજયપાલશ્રી
C)માન.મુખ્યમંત્રીશ્રી D)માન.નાણાંમંત્રીશ્રી

201. "રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશે" આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
A)48 B)49 C)50 D)51

202. એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
A)75 B)76 C)77 D)78

203. "દરેક રાજયમાં ગ્રામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
A)243 B (1) B)243 A C)243 C (1) D)243 D (1)

204. ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે?
A)માન.રાષ્ટ્રપતિશ્રી B)માન.વડાપ્રધાનશ્રી
C)માન.નાણામંત્રીશ્રી D)માન.કાયદામંત્રીશ્રી

205. સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે?
A)માન.રાષ્ટ્રપતિશ્રી B)માન.ઉપરાષ્ટ્રપતિશ્રી
C)માન.વડાપ્રધાનશ્રી D)માન.રાજયપાલશ્રી

206. "Memorandom of procedure" શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે?
A)હવાઈદળની કાર્યક્ષમતાં વધારવા
B)ન્યાયાલયોમાં નિમણૂંક માટે
C)અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો.
D)જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા

188)C, 189)D, 190)D, 191)C, 192)A, 193)A, 194)D, 195)D, 196)B, 197)B, 198)B, 199)D, 200)B, 201)C, 202)B, 203)A, 204)A, 205)A, 206)B.

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

207. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહિ?
A) અનુચ્છેદ - 24 B) અનુચ્છેદ - 26
C) અનુચ્છેદ - 28 D) અનુચ્છેદ - 30

208. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે?
A) વડાપ્રધાન B) ગૃહપ્રધાન
C) ભારતના મુખ્ય ન્યાયાધીશ D) લોકસભાના અધ્યક્ષ

209. નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી?
A) રાજ્યના રાજ્યપાલ B) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
C) વડી અદાલતના ન્યાયાધીશ D) લોકસભાના અધ્યક્ષ

210. રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે?
A) 25 વર્ષ અને 30 વર્ષ B) 30 વર્ષ અને 35 વર્ષ
C) 30 વર્ષ અને 25 વર્ષ D) 35 વર્ષ અને 30 વર્ષ

211. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા?
A) શ્રીમતી જ્ઞાનસુધા B) શ્રીમતી એમ.ફાતીમાં બીબી
C) શ્રીમતી લીલા શેઠ D) શ્રીમતી રંજના દેસાઈ

212. ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે?
A) 21 B) 22 C) 24 D) 19

213. નીચેના પૈકી ક્યો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી?
A) કલ્યાણ રાજ્યની સ્થાપના B) ધાર્મિક રાજ્યની સ્થાપના
C) સામાજિક-આર્થિક ન્યાય
D) બિન સાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી

214. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?
A) પ્રથમ વહીવટી સુધારા આયોગ
B) સતીષચંદ્ર સમિતિ
C) ક્રિપલાણી સમિતિ D) સંથાનમ સમિતિ

215. રાષ્ટ્રપતિ માહિતી કમિશ્નરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ/સલાહથી કરી શકે છે?
A) કેન્દ્રીય તકેદારી આયોગ B) સંસદ
C) સર્વોચ્ચ અદાલત D) લોકસભા

216. 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી?
A) ગુજરાતી B) તેલુગુ C) બોડો D) કોંકણી

217. ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી?
A) 13મા B) 14મા C) 15મા D) 16મા

218. કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનીક ઉપયોગ કરવા દેવામાં આવે છે?
A) ભારતીય સશસ્ત્ર દળો B) ભારતીય તબીબો
C) ભારતીય અધિકારીઓ D) ઉપરના પૈકી કોઈ નહીં

219. પોસ્ટલ બેલેટ પ્રથા ક્યા વર્ષમાં દાખલ કરવામાં આવી?
A) 1998 B) 1999 C) 2000 D) 2001

220. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે?
A) ભારતના રાષ્ટ્રપતિ B) નાણામંત્રી
C) સર્વોચ્ચ અદાલત D) સંસદ

221. ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે?
A) 10 યાદીઓ B) 12 યાદીઓ C) 14 યાદીઓ D) 16 યાદીઓ

GPSC Class - 2 - 18/12/2016

222. ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખ નો નિર્દેશ છે?
A) 26 ડિસેમ્બર, 1949 B) 26 નવેમ્બર, 1949
C) 26 જાન્યુઆરી, 1950 D) 15 ઓગસ્ટ, 1947

223. ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે?
A) પરમાદેશ (Mandanmus) B) પ્રતિષેધ (Prohibition)
C) ઉત્પ્રેષણ (Certiorari) D) અધિકાર પૃચ્છા (Quo-Warranto)

224. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો?
A) તેજ બહાદુર સપ્રુ સમિતિ B) સ્વર્ણસિંહ સમિતિ
C) નેહરુ સમિતિ D) જી.વી.કે. રાવ સમિતિ

225. જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંન્ને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે?
A) રાષ્ટ્રપતિ B) લોકસભા સ્પીકર
C) રાજ્યસભા અધ્યક્ષ D) પ્રધાનમંત્રી

226. રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે?
A) 6 માસ B) 6 સપ્તાહ C) 15 દિવસ D) 1 માસ

227. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?
A) પ્રધાનમંત્રી B) લોકસભા સ્પીકર
C) રાષ્ટ્રપતિ D) ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ

228. દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે?
A) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
B) ભારતના એટર્ની જનરલ
C) ભારતના એડવોકેટ જનરલ
D) ભારતના સોલિસિટર જનરલ

207)A, 208)C, 209)D, 210)C, 211)B, 212)C, 213)B, 214)D, 215)C, 216)C, 217)C, 218)A, 219)B, 220)D, 221)B, 222)B, 223)B, 224)B, 225)B, 226)B, 227)C, 228)B.

229. ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજય કયું હતું?
A) મહારાષ્ટ્ર B) આંધ્રપ્રદેશ C) ગુજરાત D) ઓડિશા

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

230. ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે?
A) સંપત્તિનું સમાન વિતરણ B) ન્યાયના વહીવટમાં અર્થતંત્ર
C) ગરીબોને સસ્તો ન્યાય D) સામાજિક-આર્થિક ક્રાન્તિ

231. રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે?
A) રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી
B) હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી
C) મુખ્યમંત્રી અને પ્રધાનમંડળની ખુશી હોય ત્યાં સુધી
D) (A) અને (B) બંને

232. બંધારણના ક્યા સુધારાથી મિલ્કતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે?
A) 42 મો સુધારો B) 43 મો સુધારો
C) 44 મો સુધારો D) 45 મો સુધારો

233. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે?
A) રાષ્ટ્રપતિ B) વડાપ્રધાન
C) સમાજ કલ્યાણ ખાતાના મંત્રી
D) સર્વોચ્ચ અદાલતના મુખ્ય નાયાયાધીશ

234. બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું?
A) 25 ઓકટોબર, 1948 B) 25 ઓકટોબર, 1949
C) 26 નવેમ્બર, 1948 D) 26 નવેમ્બર, 1949

235. કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે?
A) જસ્ટીસ કે.કાનન B) જસ્ટીસ એમ.હિદાયતુલ્લા
C) જસ્ટીસ સી.રેડી D) જસ્ટીસ એસ.ગોવાદાર્ડ

GPSC Class - 2 - 12/2/2017

236. મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે.
A) માત્ર લોકસભામાં B) બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ
C) બંને ગૃહની સંયુક્ત બેઠકમાં D) માત્ર રાજ્ય સભામાં

237. 'કાયદા' શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપ-નિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં દર્શાવેલ છે?
A) 13 (3)(A) B) 13 (3)(B) C) 13 (1) D) 13 (2)

238. 'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે?
A) 16 (4) B) 16 (1) C) 16 (2) D) 16 (3)

239. સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ સમાવેશ થાય છે?
A) માન.રાષ્ટ્રપતિ B) રાજ્ય સભા
C) લોકસભા D) ઉપરોક્ત બધાજ

240. માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?
A) 56 B) 57 C) 58 (1) (2) D) 59 (1)

241. સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે?
A) 124 (1) B) 124 (2) C) 124 (3) D) 124 (4)

242. એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે?
A) 65 વર્ષ B) 62 વર્ષ
C) 58 વર્ષ D) માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

243. નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
A) 279 B) 280 (1) C) 280 (2) D) 280 (3)

244. સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે?
A) માન.નાણામંત્રીશ્રી B) માન.વડાપ્રધાનશ્રી
C) માન.રાષ્ટ્રપતિશ્રી D) ઉપરોક્ત પૈકી કોઈપણ નહી

245. "કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યકિત ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવાં અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં કયાં આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
A) 323 B) 324 C) 325 D) 326

GPSC Class - 2 - 28/1/2017

246. બંધારણના કયા નિયમ (Article) હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓ ની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
A) 24 B) 25 C) 26 D) 27

247. કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે?
A) 52 B) 53 C) 54 D) 55

248. માન.રાષ્ટ્રપતિ પર "ઈમ્પીચમેન્ટ" (Impeachment of the president) મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમ (Article) માં જણાવવામાં આવેલી છે?
A) 59 B) 60 C) 61 D) 62

229)A, 230)D, 231)D, 232)C, 233)A, 234)D, 235)B, 236)D, 237)A, 238)B, 239)D, 240)C, 241)C, 242)D, 243)B, 244)C, 245)C, 246)C, 247)B, 248)C.

249. હાઈકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કોણ કરે છે?
A) માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી B) માન.ગવર્નર શ્રી
C) મા.મુખ્યમંત્રીશ્રી D) માન.કાયદામંત્રીશ્રી

250. માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?
A) 73 B) 74 C) 75 D) 76

251. "રાજય સેવા આયોગ"ની સ્થાપના બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?
A) 314 B) 315 (1) C) 316 (1) D) 317 (1)

252. રાજયો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે?
A) માન.કાયદામંત્રીશ્રી B) માન.મુખ્યમંત્રીશ્રી
C) માન.ગવર્નર શ્રી D) માન.રાષ્ટ્રપતિશ્રી

253. કોમ્પ્ટ્રોલર અને ઑડીટર જનરલ હિસાબો સંબંધનો રાજય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે?
A) મા.રાષ્ટ્રપતિ B) મા.રાજયપાલ શ્રી
C) મા.મુખ્યમંત્રીશ્રી D) મા.નાણામંત્રીશ્રી

GPSC Class-1 - 15/01/2017

254. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ?
A) રેગ્યુલેટીંગ એક્ટ, 1773 B) ચાર્ટર એક્ટ, 1813
C) ચાર્ટર એક્ટ, 1833 D) ચાર્ટર એક્ટ, 1853

255. 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ - 45 માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે?
A) તા.1-4-2010 B) તા.1-1-2010
C) તા.1-4-2011 D) તા.1-1-2011

256. કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે?
A) 42 મા B) 43 મા C) 44 મા D) 45 મા

257. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે?
A) 10 B) 12 C) 11 D) 14

258. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી?
A) લોકસભા B) રાજયસભા C) રાષ્ટ્રપતિ D) ઉપરાષ્ટ્રપતિ

259. લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે?
A) લોકસભાના સ્પીકર B) રાષ્ટ્રપતિ
C) વડાપ્રધાન D) સંસદીય બાબતોના મંત્રી

260. મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે?
A) મહારાષ્ટ્ર B) ગોવા
C) દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી
D) ઉપર ત્રણેય વિકલ્પમાં દર્શાવેલ

261. હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે?
A) 24 B) 29 C) 32 D) 35

GPSC Class-1 - 15/01/2017

262. મૂળભૂત ફરજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?
A) યુ.કે. B) યુ.એસ.એ. C) રશિયા D) આયરલેન્ડ

263. બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?
A) શ્રી જવાહરલાલ નેહરુ B) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
C) ડૉ.ભીમરાવ આંબેડકર D) શ્રી એમ.એન. રોય

264. 1959માં પંચાયતીરાજની સ્થાપના ક્યા પ્રથમ રાજ્યમાં થઈ ?
A) ગુજરાત B) ઉત્તર પ્રદેશ C) આંધ્રપ્રદેશ D) રાજસ્થાન

265. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે ?
A) 21A B) 22A C) 23A D) 24A

266. રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ?
A) 10 થી 12 વર્ષ B) 06 થી 14 વર્ષ
C) 01 થી 10 વર્ષ D) 07 થી 18 વર્ષ

267. રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો?
A) 2005 B) 2006 C) 2009 D) 2010

268. રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે .... % સીટો અનામત રાખવામાં આવે છે.
A) 10 B) 20 C) 25 D) 30

269. ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો?
A) 2 વર્ષ 2 મહિના 12 દિવસ B) 2 વર્ષ 11 મહિના 11 દિવસ
C) 2 વર્ષ 2 મહિના 10 દિવસ D) 2 વર્ષ 11 મહિના 18 દિવસ

270. ભારતના બંધારણના ક્યા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?
A) ત્રીજા B) ચોથા C) પાંચમા D) છઠ્ઠા

271. ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ?
A) 10 B) 11 C) 12 D) 13

249)A, 250)D, 251)B, 252)C, 253)B, 254)B, 255)A, 256)A, 257)C, 258)D, 259)B, 260)D, 261)A, 262)C, 263)D, 264)D, 265)A, 266)B, 267)C, 268)C, 269)D, 270)C, 271)C.

272. બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

A) કલમ - 51 એ B) કલમ - 41

C) કલમ - 24 D) બંધારણમાં જોગવાઈ નથી

273. કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ?

A) સામાજિક વીમો B) સામાજિક સેવાઓ

C) ગરીબી નિવારણના કાર્યક્રમો D) સામાજિક વહીવટ

274. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ. જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ?

A) 334 B) 338 C) 330 D) 332

275. ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી ?

A) 61મો સુધારો B) 63મો સુધારો

C) 60મો સુધારો D) 62મો સુધારો

276. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો?

A) 1951 B) 1953 C) 1956 D) 1960

277. ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ B) ડૉ. બી.આર. આંબેડકર

C) જવાહરલાલ નહેરુ D) ડૉ. સચ્ચિદાનંદ સિંહ

278. માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્યતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોવ છે ?

A) 30 દિવસ B) 24 દિવસ C) 48 દિવસ D) 12 દિવસ

279. કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે ?

A) 338 B) 330 C) 332 D) 334

280. અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ?

A) કલમ 16 B) કલમ 17 C) કલમ 18 D) કલમ 14

281. જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે ?

A) 306 B) 370 C) 311 D) 309

282. ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ ક્યા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ?

A) ફક્ત ભાષાના આધારે B) ભાષા અથવા જાતિના આધારે

C) ફક્ત ધર્મના આધારે D) ભાષા અથવા ધર્મના આધારે

283. ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ?

A) 380 B) 389 C) 390 D) 391

284. બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે ?

A) 381 B) 382 C) 338 D) 384

285. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે ?

A) શિડ્યુલ 1 અને 2 B) શિડ્યુલ 2 અને 3

C) શિડ્યુલ 3 અને 4 D) શિડ્યુલ 5 અને 6

286. ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ?

A) 1989 B) 1990 C) 1991 D) 1992

287. બંધારણના ક્યા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ?

A) અનુચ્છેદ - 14 B) અનુચ્છેદ - 15

C) અનુચ્છેદ - 16 D) અનુચ્છેદ - 17

288. સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક............

A) મૂળ અધિકાર છે. B) આર્થિક અધિકાર છે.

C) મૂળ કર્તવ્ય છે. D) રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.

289. બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરૂદ્ધનો હક્ક ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

A) 19 થી 22 B) 23 થી 24 C) 29 થી 30 D) 32

290. ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ?

A) ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ

B) લોકસભા/રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ

C) ભાષાન્ત સમાવિષ્ઠી D) જમીન સુધારણા

291. ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે?

A) 10 B) 13 C) 15 D) 20

292. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ?

A) 22 B) 19 C) 25 D) 18

293. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે ?

A) 25 B) 35 C) 30 D) 28

294. ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ક્યા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ?

A) 352 B) 360 C) 356 D) 359

295. ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?

A) આદિવાસી વિસ્તારો B) જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર

C) હિમાલયના પહાડી વિસ્તાર D) જંગલ વિસ્તાર

296. રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

A) સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

B) પછાતવર્ગના સંસદ સભ્ય

C) કેન્દ્ર સરકારના અગ્રસચિવ D) જાણીતા સમાજવિજ્ઞાની

272)C, 273)D, 274)B, 275)A, 276)A, 277)C, 278)C, 279)A, 280)B, 281)B, 282)D, 283)B, 284)C, 285)D, 286)B, 287)C, 288)D, 289)B, 290)A, 291)C, 292)B, 293)A, 294)C, 295)A, 296)A.

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

297. લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ?

A) ગૃહની કામકાજ સમિતી

B) પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય

C) સંસદીય બાબતોના મંત્રીશ્રી

D) સ્પીકર

298. ભારતની સંસદમાં સંઘપ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ?

A) 20 સભ્યો B) 15 સભ્યો C) 13 સભ્યો D) 17 સભ્યો

299. ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ?

A) 26-01-1950 B) 26-01-1949

C) 26-11-1949 D) 26-11-1950

300. એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે ?

A) સ્વાતંત્ર્યનો અધિકાર

B) કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર

C) ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ

D) જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ

301. મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે?

A) મૂળભૂત અધિકારોમાં B) મૂળભૂત ફરજોમાં

C) માર્ગદર્શક સિદ્ધાંતોમાં D) સંઘના ન્યાયતંત્રમાં

302. ભાષાપંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

A) રાષ્ટ્રપતિ B) ઉપરાષ્ટ્રપતિ

C) માનવસંસાધન મંત્રી D) સર્વોચ્ચ અદાલત

303. જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે

A) સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે

B) સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે

C) સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે

D) સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે

304. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)ને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય ?

A) સર્વોચ્ચ અદાલતના હૂકમથી B) રાષ્ટ્રપતિના હૂકમથી

C) મહાભિયોગ દ્વારા D) વહીવટી હૂકમ દ્વારા

305. એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ?

A) ફક્ત સર્વોચ્ચ અદાલતમાં

B) ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં

C) સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતમાં

D) ભારત પ્રદેશની તમામ અદાલતોમાં

306. નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?

A) અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો

B) અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો

C) અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

D) અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર

307. અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

A) 338 B) 242 C) 226 D) 358

308. પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે?

A) 243-D B) 202 C) 341 D) 342

309. ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલી છે?

A) કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર

B) ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ

C) ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ

D) કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા

310. નીચેના પૈકી ક્યા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ?

1. બેરૂબારી યુનિયન 2. કેશવાનંદ ભારતી

3. એલઆઈસી ઓફ ઈન્ડિયા

A) ફક્ત 1 અને 2 B) ફક્ત 2

C) ફક્ત 1 અને 3 D) 1, 2 અને 3 તમામ

311. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

A) 1947 B) 1948 C) 1950 D) 1952

312. નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ?

A) બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો

B) અનુચ્છેદ 297Aમાં સુધારો

C) બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો

D) ઉપરના તમામ

313. મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે?

A) પ્રધાનમંત્રી B) લોકસભાના વિરોધપક્ષના નેતા

C) કાયદામંત્રી D) સર્વોચ્ચ અદાલતનાં મુખ્યન્યાયધીશ

297)D, 298)A, 299)C, 300)C, 301)C, 302)A, 303)B, 304)C, 305)D, 306)B, 307)A, 308)A, 309)C, 310)B, 311)D, 312)B, 313)A.

314. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ?

A) 14 B) 12 C) 10 D) 13

GPSC Class - 2 - 16/04/2017

315. લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા?

A) હુકુમ સીંઘ B) ગણેશ વી. માવલંકર
C) ક.મા.મુનશી D) યુ.એન.ઢેબર

316. "ભારતનાં રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક" ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે?

A) 18 B) 19 C) 20 D) 21

317. "ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ" એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે?

A) 22 B) 23 C) 24 D) 25

318. "મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે?

A) 21 વર્ષથી વધુ ઉમરનાં વ્યક્તિને
B) 25 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિને
C) ભારતના દરેક નાગરિકને
D) ઉપરોક્ત પૈકી કોઈપણ નહીં

319. "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે?

A) મૂળભૂત ફરજો B) મૂળભૂત હક્કો
C) રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો D) આમુખ

320. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે?

A) આંધ્રપ્રદેશ B) ગુજરાત C) મહારાષ્ટ્ર D) ઉત્તર પ્રદેશ

321. લોકસભાની ચુંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

A) 325 B) 326 C) 327 D) 328

322. "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

A) 53 B) 54 C) 55 D) 56

323. સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (Original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

A) 129 B) 130 C) 131 D) 132

324. સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને આપવામાં આવેલી છે?

A) માન.મુખ્ય મંત્રીશ્રી B) માન.નાણા મંત્રીશ્રી
C) માન.રાજ્યપાલશ્રી D) માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી

325. લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનનાં કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?

A) 318 B) 319 C) 320 D) 321

326. હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે?

A) 13મી લોકસભા B) 15મી લોકસભા
C) 16મી લોકસભા D) 17મી લોકસભા

327. "ચુંટણી માટે રાજ્ય દ્વારા નાણાકિય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી?

A) શ્રી અશોક સમિતિ B) શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ
C) શ્રી સરકારીયા કમીશન D) શ્રી દિનેશ સમિતિ

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

328. કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ?

A) દુકાનો, હોટલ B) કુવા ઉપર પાણી ભરવા
C) જાહેર રસ્તાનો ઉપયોગ D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

329. એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે ?

A) પાંચ વર્ષ B) ત્રણ વર્ષ
C) રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
D) વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી

330. પાર્લામેન્ટના બન્ને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

A) અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
B) તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજની જાહેર કરાય ત્યારે
C) નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
D) ઉપરોક્ત બધાજ સંજોગોમાં

331. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

A) મુખ્યમંત્રીશ્રીને B) વિધાનસભાના અધ્યક્ષશ્રીને
C) માનનીય રાજ્યપાલશ્રીને D) રાજ્યના મુખ્ય સચિવશ્રીને

332. દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ?

A) માનનીય વડાપ્રધાનશ્રી B) માનનીય રાષ્ટ્રપતિશ્રી
C) માનનીય રાજ્યપાલશ્રી D) સંસદ

333. નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?

A) ત્રણ B) છ C) પાંચ D) ચાર

334. રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

A) નામદાર રાષ્ટ્રપતિશ્રી B) નામદાર રાજ્યપાલશ્રી
C) માનનીય વડાપ્રધાનશ્રી
D) સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી

314)A, 315)B, 316)B, 317)A, 318)C, 319)A, 320)D, 321)B, 322)C, 323)C, 324)C, 325)C, 326)C, 327)B, 328)D, 329)C, 330)D, 331)C, 332)B, 333)D, 334)B.

335. માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્‌ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
A)350 B)354 C)352 D)353

336. અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ"ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
A)338 B)338-ક C)335 D)337

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

337. 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવેલ છે ?
A)50 B)51 C)52 D)53

338. માન. રાજ્યપાલશ્રીની મુદત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે?
A)ત્રણ વર્ષ B)પાંચ વર્ષ C)છ વર્ષ D)ચાર વર્ષ

339. 'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?
A)મૂળભૂત ફરજો B) રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
C) મૂળભૂત હક્કો D)આમુખ

340. સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે ?
A)31 B)30 C)29 D)28

341. 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચત્તમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય.
A)માત્ર પ્રથમ B) માત્ર બીજુ
C) 1 અને 2 D)બન્ને વિધાન સાચા નથી

342. સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલા કમિશનર કાર્યાન્વિત છે ?
A)એક B)બે C)ત્રણ D)ચાર

343. 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
A)નીતિ આયોગ B) કેન્દ્રીય સતર્કતા આયોગ
C) IIM કોલકાતા D) IIM અમદાવાદ

344. 1. ત્રિસ્તરીય માળખું ઊભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી
ઉપરોક્ત બાબતો બંધારણના ક્યા સુધારાને કારણે અમલી બનેલ છે.
A)71મો સુધારો B) 72મો સુધારો
C) 73મો સુધારો D) 74મો સુધારો

345. બંધારણના આર્ટીકલ-280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે?
A)રાષ્ટ્રપતિ B)વડાપ્રધાન
C)નાણામંત્રી D)RBIના ગવર્નર

346. નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે?
A)સંસદના દરેક ગૃહને B) રાજ્યોની વિધાનસભાને
C) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને
D)ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને

347. 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે' - આ જોગવાઈ બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે ?
A)323 B)324 C)325 D)326

348. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે?
A)નાણાંમંત્રીને B)વડાપ્રધાન
C)રાષ્ટ્રપતિ D)એકપણ નહી

349. 'લોક સેવા આયોગ'ના કાર્યોની વિગતો ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ?
A)318 B)319 C)320 D)321

350. કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી ?
A)સને 2005 B)સને 2006 C)સને 2007 D)સને 2008

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

351. ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી?
A)40 માં B)42માં
C)44માં D)ઉપરના પૈકી કોઈ નહીં

352. ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા થઈ હતી?
A)મદ્રાસ B)અમદાવાદ C)મુંબઈ D)કોલકત્તા

353. આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન લેવામાં આવી હતી?
A)બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879
B)ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્ષ) એક્ટ, 1965
C)પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965
D)ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963

354. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન-જાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે?
A)109 B)119 C)129 D)131

335)C, 336)B, 337)D, 338)B, 339)B, 340)A, 341)C, 342)B, 343)A, 344)C, 345)A, 346)A, 347)B, 348)C, 349)C, 350)A, 351)B, 352)A, 353)C, 354)D.

355. કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ?

A)3 B)4 C)5 D)6

356. રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચુંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ?

A)જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં

B)જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં

C)જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં

D)જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં

357. બે કે વધુ રાજ્યો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે.

A)સંસદ B)રાષ્ટ્રપતિ

C)સર્વોચ્ચ અદાલત D)લોકસભા

358. 74મો સુધારો અધિનિયમ અન્ય ક્યા નામે ઓળખાય છે?

A)મેટ્રોપોલીટન અધિનિયમ

B)ગ્રામપંચાયત અધિનિયમ

C)ઔદ્યોગિક નોટીફાઈડ વિસ્તાર અધિનિયમ

D)નગરપાલિકા અધિનિયમ

359. જ્યારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે?

A)રાજયના રાજ્યપાલ B)રાજયની વડી અદાલત

C)ભારતના રાષ્ટ્રપતિ D)સંઘ સંસદ

360. 42 માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે,......

A)વ્યકિતનું ગૌરવ અને બંધુતાની ખાતરી

B)વિચાર, અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા

C)દરજ્જાની સમાનતા

D)રાષ્ટ્રની એકતા અને અખંડીતતા

361. મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42 માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી?

A)42 B)55 C)44 D)46

362. રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે?

A)અપીલીય હકૂમત B)મૂળ હકૂમત

C)સલાહકીય હકૂમત D)રીટ હકૂમત

363. લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે?

A)નિર્ણાયક મત B)ધ્વનિ મત

C)સીધો મત D)આડકતરો મત

364. વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે?

A)રાજયો B)રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો

C)કેન્દ્રશાસિત પ્રદેશો D)ઉપરોકત એકપણ નહીં

365. સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે?

A)અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફી B)સત્ર સમાપ્તિ

C)સત્ર બોલાવવું D)સત્ર વિસર્જન

366. કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશ્નરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

A)રાષ્ટ્રપતિ B)ગૃહમંત્રી

C)પ્રધાનમંત્રી D)લોકસભાના વિરોધ પક્ષના નેતા

367. સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય?

A)મૂળ હકુમત B)સલાહકારી હેકુમત

C)અપીલીય હકુમત D)ઉપરોક્ત એકપણ નહી

368. બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે?

A)રાજસ્થાન B)પશ્ચિમ બંગાળ

C)તેલગાંણા D)ઓડિશા

369. ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે?

A)30 દિવસ B)60 દિવસ C)90 દિવસ D)120 દિવસ

370. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ ક્યા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું?

A)97 મો બંધારણીય સુધારો-2011

B)44 મો બંધારણીય સુધારો-1978

C)42 મો બંધારણીય સુધારો-1976

D)89 મો બંધારણીય સુધારો-2003

371. માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ........

A)અનુચ્છેદ 21 અંતગર્ત રાજય વિરૂધ્ધનો વ્યકિતનો મૂળભૂત અધિકાર છે.

B)અનુચ્છેદ 51A અંતગર્ત નાગરિકની મૂળભૂત ફરજ છે.

C)અનુચ્છેદ 17 અંતગર્ત નાગરિક વિરૂધ્ધનો રાજયનો મૂળભૂત અધિકાર છે.

D)અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે.

372. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરીયાદની તપાસ અને પૂછપરછ

A)3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

B)12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

C)6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

D)9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

373. ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે?

A)સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ

B)એટર્ની જનરલ

C)રાષ્ટ્રપતિ D)કેન્દ્રના કાયદામંત્રી

355)B, 356)D, 357)A, 358)D, 359)D, 360)D, 361)B, 362)B, 363)A, 364)B, 365)A, 366)C, 367)A, 368)C, 369)B, 370)D, 371)D, 372)C, 373)B.

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

374. બંધારણમાં 74માં સુધારા અન્વયે કયાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી?
A)અનુચ્છેદ-241 B)અનુચ્છેદ-242
C)અનુચ્છેદ-243 D)અનુચ્છેદ-245

375. લઘુમતિઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર
A)ધર્મ અને સંસ્કૃતિ છે B)ધર્મ અને ભાષા છે
C)સંસ્કૃતિ અને ભાષા છે D)ધર્મ અને જાતિ છે

376. નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે?
A)અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
B)અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો
C)અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
D)અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો

377. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે?
A)રાષ્ટ્રપતિ B)ઉપરાષ્ટ્રપતિ C)સ્પીકર D)પ્રધાનમંત્રી

378. કોની ભલામણ મુજબ રાજયોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે?
A)આયોજન પંચ B)નાણાપંચ
C)નીતિ આયોગ D)કેન્દ્ર સરકાર

379. બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં ક્યો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો?
A)સમાન ન્યાય અને મફત કાનૂની સહાય
B)શિક્ષણનો અધિકાર
C)અંગત જીવનનો અધિકાર
D)સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર

380. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે?
A)8મી યાદી B)9મી યાદી C)11મી યાદી D)12મી યાદી

381. સંસદમાં શેનો સમાવેશ થાય છે?
A)બન્ને ગૃહ B)બન્ને ગૃહ અને અધ્યક્ષ
C)બન્ને ગૃહ અને રાષ્ટ્રપતિ D)લોકસભા

382. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે?
A)5 વર્ષ માટે B)બીજી ચુંટણી થાય ત્યાં સુધી
C)રાષ્ટ્રપતિની મરજી સુધી D)10 વર્ષ માટે

383. સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ?
A)ગૃહના કુલ સભ્યોનો 1/2 ભાગ
B)ગૃહના કુલ સભ્યોનો 1/4 ભાગ
C)ગૃહના કુલ સભ્યોનો 2/3 ભાગ
D)ગૃહના કુલ સભ્યોનો 1/10 ભાગ

384. સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ કયારે અસરકારકતા ગુમાવે છે?
A)6 મહિનાના અંતે B)6 અઠવાડીયાના અંતે
C)3 મહિનાના અંતે D)3 અઠવાડીયાના અંતે

385. બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે?
A) "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
B) "ભાષા, વિધિ અથવા રિવાજ"
C) "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
D) "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"

386. ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરુ કરી શકે?
A)ફક્ત લોકસભા B)ફક્ત રાજયસભા
C)સંસદના બેમાંથી કોઈ એક ગૃહ D)કોઈ પણ વિધાનસભા

387. ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા"નો સમાવેશ કઈ યાદીમાં થયો છે?
A)રાજ્ય યાદી B)સંઘ યાદી
C)સંયુક્ત યાદી D)ઉપરના પૈકી કોઈ નહીં

388. ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે?
A)ચોથી B)પાંચમી C)સાતમી D)નવમી

389. દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજયની સરકાર હેઠળ ઓછામાં ઓછા..........વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ.
A)07 B)05 C)03 D)10

390. લોકસભામાં "શૂન્ય કાળનો" મહત્તમ સમયગાળો કેટલો હોય છે?
A)એક કલાક B)30 મિનીટ C)નિશ્ચિત કરેલ નથી D)90 મિનીટ

391. જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે?
A)કાશ્મીરી B)ઉર્દૂ C)હિન્દી D)ડોગરી

392. નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે?
A)સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી
B)કેન્દ્રીય મંત્રીમંડળ
C)ભારતના રાષ્ટ્રપતિ D)કેન્દ્રીય ગૃહમંત્રી

393. રાજયપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે?
A)અનુચ્છેદ - 161 B)અનુચ્છેદ - 163
C)અનુચ્છેદ - 166 D)અનુચ્છેદ - 213

394. લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા?
A)ચરણસિંહ ચૌધરી B)ચંદ્રશેખર
C)એચ.ડી.દેવેગૌડા D)આઈ.કે.ગુજરાલ

374)C, 375)B, 376)B, 377)C, 378)B, 379)B, 380)D, 381)C, 382)C, 383)D, 384)B, 385)D, 386)C, 387)A, 388)C, 389)D, 390)C, 391)B, 392)C, 393)D, 394)A.

GPSC Class - 2 - 18/03/2017

395. ભારતના સંવિધાનમાં "રાજય"ની વ્યાખ્યા કયા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?
A)10 B)11 C)12 D)13

396. "પુરૂષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?
A)39 (A) B)39 (B) C)39 (C) D)39 (D)

397. "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકાશે નહી" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
A)124 B)123 C)122 D)120

398. "રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
A)47 B)48 C)49 D)50

399. ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે?
A)રાજય સભાના વાઈસ-ચેરમેન
B)લોકસભાના અધ્યક્ષ
C)માન.રાષ્ટ્રપતિશ્રી
D)ઉપરોકત પૈકી એક પણ નહી

400. માન.રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે?
A)ભારત સરકાર B)રાજય સરકાર
C)ખાનગી કંપનીઓ D)જાહેર ક્ષેત્રના એકમો

401. માન.રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગ ની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે?
A)277 B)279 C)280 D)282

402. રાજય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે?
A)માન.રાષ્ટ્રપતિશ્રી B)માન.ગવર્નરશ્રી
C)માન.મુખ્યમંત્રીશ્રી D)માન.કાયદા મંત્રીશ્રી

403. "નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?
A)149 B)148 C)147 D)146

GPSC Class - 1 - 28/01/2017

404. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા?
A)40 માં B)42 માં C)43 માં D)44 માં

405. 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
A)અનુચ્છેદ 21 B)અનુચ્છેદ 22
C)અનુચ્છેદ 21-ક D)અનુચ્છેદ 20

406. જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?
A)અનુચ્છેદ - 16 B)અનુચ્છેદ - 13
C)અનુચ્છેદ - 12 D)અનુચ્છેદ - 19

407. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થયને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?
A)અનુચ્છેદ - 24 B)અનુચ્છેદ - 23
C)અનુચ્છેદ - 22 D)અનુચ્છેદ - 25

408. પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી?
A)અનુચ્છેદ - 45 B)અનુચ્છેદ - 48
C)અનુચ્છેદ - 48-ક D)અનુચ્છેદ - 46

409. ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે?
A)માનનીય રાષ્ટ્રપતિ B)રાજયસભા
C)લોકસભા
D)માનનીય રાષ્ટ્રપતિ, રાજયસભા અને લોકસભા

410. એંગ્લો ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુકત કરી શકાશે?
A)2 B)3 C)4 D)5

411. રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે?
A)વડાપ્રધાનને B)ઉપરાષ્ટ્રપતિ
C)ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
D)લોકસભાના સ્પીકર

412. કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે?
A)વડાપ્રધાનના
B)સંબંધિત રાજયના મુખ્યપ્રધાનના
C)વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
D)રાષ્ટ્રપતિના

નાયબ ચિટનીશ - 02/06/2015

413. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે?
A)25 B)35 C)30 D)28

395)C, 396)A, 397)C, 398)D, 399)C, 400)A, 401)C, 402)B, 403)B, 404)B, 405)C, 406)A, 407)D, 408)C, 409)D, 410)A, 411)B, 412)D, 413)A.

414. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ.........હતા.
A) ડૉ. હામિદ અન્સારી B) ડૉ. રાધાકૃષ્ણન
C) ડૉ. ઝાકિર હૂસેન D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

415. લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ?
A) 11 B) 182 C) 26 D) 37

416. ભારતની સંસદ એટલે :
(1) લોકસભા (2) રાજયસભા
(3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (4) રાષ્ટ્રપતિ
A) (1), (2), (3) B) (1), (2), (4)
C) (1), (3), (4) D) બધા જ

નાયબ ચિટનીશ - 05/02/2017

417. નીચેની કઈ ગુજરાતી વ્યકિત બંધારણસભામાં સભ્ય ન હતી ?
A) હંસા મહેતા B) કનૈયાલાલ મુનશી
C) સરદાર પટેલ D) રવિશંકર મહારાજ

418. ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?
A) 15 ઓગસ્ટ, 1950 B) 26 જાન્યુઆરી, 1950
C) 26 જાન્યુઆરી, 1947 D) 15 ઓગસ્ટ, 1947

419. કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે?
A) વિશેષ ખરડો B) નાણાકીય ખરડો
C) બંધારણીય ખરડો D) પ્રશાસકીય ખરડો

GPSC Class - 2 - 16/04/2017

420. 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ?
A) ઋગ્વેદ B) શતપથ બ્રાહ્મણ
C) મુંડકોપનિષદ D) રામાયણ

421. નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે?
A) માન.રાષ્ટ્રપતિ B) માન.વડાપ્રધાન
C) માન.નાણામંત્રી D) માન.RBIના ગવર્નર

422. માન.રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે?
A) 14 B) 12 C) 13 D) 11

423. સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -
A) ભાગ લઈ શકતા નથી
B) પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
C) સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
D) સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.

424. સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો?
A) ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
B) ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
C) નેશનલ જ્યુડીશ્યલ એપોઈન્ટમેન્ટ કમિશન
D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

425. પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે?
A) સંસદની સંખ્યાના 12%
B) સંસદની સભ્ય સંખ્યાના 15%
C) લોકસભાની સભ્ય સંખ્યાના 15%
D) રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%

426. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે?
A) લોકસભાના સ્પીકર B) ચૂંટણી કમિશ્નર
C) વડાપ્રધાન D) માન.રાષ્ટ્રપતિ

427. રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે?
A) વિધાનસભાના સ્પીકરશ્રી B) ચૂંટણી કમિશનરશ્રી
C) માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
D) માન.રાજ્યપાલશ્રી

428. ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે?
A) 9 B) 10 C) 11 D) 12

429. બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે?
A) 71મો સુધારો B) 72મો સુધારો
C) 73મો સુધારો D) 74મો સુધારો

430. 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી?
A) બંધારણમાં જરૂરી સુધારો કરીને
B) મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
C) સંસદમાં કાયદો સુધારીને D) કોર્ટના ચુકાદાનું પાલન કરવા

431. દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે?
A) ભારતનું નિર્વાચન આયોગ (ECI)
B) ભારતીય રીઝર્વ બેંક
C) લોકસભાનાં માન.અધ્યક્ષશ્રી
D) માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી

432. બંધારણની જોગવાઈઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
A) 277 B) 278 C) 279 D) 280

414)B, 415)C, 416)B, 417)D, 418)B, 419)B, 420)C, 421)A, 422)A, 423)C, 424)A, 425)B, 426)D, 427)D, 428)C, 429)C, 430)B, 431)A, 432)C.

GPSC Class - 2 - 02/04/2017

433. લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો ક્યા અનુચ્છેદમાં વર્ણિત છે?
A)અનુચ્છેદ-24થી 29 B)અનુચ્છેદ-29 અને 30
C)અનુચ્છેદ-29 થી 31 D)અનુચ્છેદ-25 થી 28

434. નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ) જરૂરી નથી ?
A)અધિકાર પૃચ્છા B)બંદી પ્રત્યક્ષીકરણ
C)પરમાદેશ D)ઉત્પ્રેષણ

435. દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના ક્યા ભાગમાં વર્ણિત છે ?
A)પાંચમા B)ચોથા C)છઠ્ઠા D)એકપણ નહીં

436. મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં ક્યા વર્ષે ઉમેરવામાં આવી ?
A)વર્ષ 1969 B)વર્ષ 1971 C)વર્ષ 1976 D)વર્ષ 1978

437. સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
A)અનુચ્છેદ-14 થી 18 B)અનુચ્છેદ-19 થી 22
C)અનુચ્છેદ-25થી 28 D)અનુચ્છેદ-23 થી 24

438. બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના ક્યા ભાગમાં જણાવાયું છે ?
A)રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
B)મૂળભૂત હકો
C)મૂળભૂત ફરજો D)ઉપર પૈકી એકપણ

439. ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે?
A)વિધાનસભા B)રાજ્યપાલ
C)સામાન્ય વહીવટ વિભાગ D)મુખ્યમંત્રી

440. સંવિધાનના અનુચ્છેદ-352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ?
A)1 B)2 C)3 D)4

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

441. નીચેના પૈકી કોણ સંસદનાં બન્ને ગૃહોમાં બોલી શકે છે ?
A)સોલીસીટર જનરલ B)એડવોકેટ જનરલ
C)એટર્ની જનરલ D)ઉપરના તમામ

442. ભારતના બંધારણનો ક્યા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈંડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ?
A)અનુચ્છેદ 331 B)અનુચ્છેદ 332
C)અનુચ્છેદ 333 D)અનુચ્છેદ 334

443. ભારતમાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે?
A)અનુચ્છેદ 124 B)અનુચ્છેદ 129
C)અનુચ્છેદ 141 D)અનુચ્છેદ 142

444. 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ?
A)ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
B)ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ
C)નેશનલ જ્યુડીશીયલ કમિશન
D)નીતિ આયોગની રચના

445. નીચેના પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ?
A)221 B)226 C)323 D)392

446. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
A)અનુચ્છેદ 14 B)અનુચ્છેદ 15
C)અનુચ્છેદ 16 D)અનુચ્છેદ 17

447. રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર
A)રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે
B)લોકસભાને રજૂ કરવામાં આવે છે
C)રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે
D)રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે

448. સંઘના હિસાબો લગતનાં કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?
A)લોકસભાને B)સંસદનાં દરેક ગૃહને
C)રાષ્ટ્રપતિને D)રાજ્યસભાને

449. વટહુકમ કરવાની સત્તા કોની છે ?
A)મુખ્યમંત્રી B)મંત્રી પરિષદ
C)રાજ્યપાલ D)વિધાનસભા

450. નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?
A)આઈવર જેનીંગસ્ B)એ.વી. ડાઈસી
C)હેરોલ્ડ લાસ્કી D)ડૉ.બી.આર. આંબેડકર

451. સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?
A)અનુચ્છેદ 162 B)અનુચ્છેદ 368
C)અનુચ્છેદ 268 D)અનુચ્છેદ 262

452. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે ?
A)રાષ્ટ્રપતિ B)વડાપ્રધાન
C)રાજ્યસભાના અધ્યક્ષ D)લોકસભાના અધ્યક્ષ

433)B, 434)A, 435)D, 436)C, 437)B, 438)D, 439)A, 440)C, 441)C, 442)C, 443)B, 444)B, 445)B, 446)D, 447)B, 448)C, 449)C, 450)A, 451)B, 452)D.

GPSC Class - 2 - 12/02/2017

453. ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજયને લાગુ પડતો નથી?
A)ગોવા B)હિમાચલ પ્રદેશ
C)નાગાલેન્ડ D)ઓરિસ્સા

454. રાજય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જયાં રાજયમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજયપાલ વટહુકમ બહાર પાડી શકે છે?
A)અનુચ્છેદ - 168 B)અનુચ્છેદ - 202
C)અનુચ્છેદ - 214 D)અનુચ્છેદ - 213

455. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે?
A)85મા B)89મા C)87મા D)88મા

456. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે?
A)6 B)8 C)4 D)5

457. કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુકતની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે?
A)વડાપ્રધાન દ્વારા B)રાષ્ટ્રપતિ દ્વારા
C)કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા D)કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા

458. કોઈપણ રાજયમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબીનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજયમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે?
A)354 B)359 C)356 D)360

GPSC Class - 1 - 09/04/2017

459. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ?
A)અનુચ્છેદ 14 B)અનુચ્છેદ 15
C)અનુચ્છેદ 16 D)અનુચ્છેદ 17

460. કેન્દ્રિય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?
A)મંડલ સમિતિ B)તેજબહાદુર સપ્રુ સમિતિ
C)સ્વર્ણસિંહ સમિતિ D)કે. સંથાનલ સમિતિ

461. ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી .... વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.
A)ન્યાયપૂર્ણ પદ્ધતિ B)સ્વતંત્રતા
C)સમાનતા D)બંધુતા

462. રાજયસભામાં રાજ્યોના અને સંઘ રાજયક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે.
A)બીજી B)ત્રીજી C)ચોથી D)સાતમી

463. કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરઓઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં ?
A)2021 B)2026 C)2030 D)2025

464. અમુક સંજોગોમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ?
A)અનુચ્છેદ - 106 B)અનુચ્છેદ - 107
C)અનુચ્છેદ - 108 D)અનુચ્છેદ - 109

465. ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?
A)વડાપ્રધાન B)ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
C)કેન્દ્રિય કાયદા પ્રધાન D)કેન્દ્રિય કાયદા સચિવ

466. રાજયપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
A)અનુચ્છેદ - 200 B)અનુચ્છેદ - 201
C)અનુચ્છેદ - 202 D)અનુચ્છેદ - 203

467. સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજયક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે?
A)1 B)2
C)3
D)રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ

468. સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે?
A)2 B)3 C)4 D)5

GPSC Class - 2 - 04/03/2017

469. ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી?
A)1861 નો અધિનિયમ B)ભારત સરકાર અધિનિયમ 1919
C)1909 નો અધિનિયમ D)ભારત સરકાર અધિનિયમ, 1935

453)C, 454)D, 455)B, 456)B, 457)B, 458)C, 459)B, 460)D, 461)D, 462)C, 463)B, 464)C, 465)B, 466)C, 467)D, 468)C, 469)B.

470. ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા?
A) જુલાઈ, 1961 B) નવેમ્બર, 1961
C) ડિસેમ્બર, 1961 D) જાન્યુઆરી, 1962

471. આમુખમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ?
A) 42મા B) 40મા C) 44મા D) 46મા

472. ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?
A) ઈંગ્લેન્ડ B) રશિયા C) અમેરિકા D) ઓસ્ટ્રેલિયા

473. બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
A) અનુચ્છેદ - 30 B) અનુચ્છેદ - 32
C) અનુચ્છેદ - 31 D) અનુચ્છેદ - 33

474. ભારતીય બંધારણમાં રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો ક્યા દેશના બંધારણથી પ્રેરિત છે ?
A) અમેરિકા B) જર્મની C) રશિયા D) આર્યલેન્ડ

475. કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?
A) સંથાનમ સમિતિ B) તારકુન્ડે સમિતિ
C) ઈન્દ્રજીત સમિતિ D) દિનેશ ગોસ્વામી સમિતિ

476. પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
A) વાય.વી. રેડ્ડી B) કે.સી. નિયોગી
C) કે.સાંથનમ D) વિજય કેલકર

477. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવિષ્ટ છે ?
A) પ્રધાનમંત્રી B) મુખ્યમંત્રી C) રાષ્ટ્રપતિ D) રાજ્યપાલ

GPSC Class - 2 - 18/03/2017

478. લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ?
A) વડાપ્રધાન B) લોકસભાના સ્પીકર
C) વિરોધ પક્ષના નેતા D) માનવસંશાધન પ્રધાન

479. રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ?
A) છ માસ B) એક માસ
C) છ અઠવાડિયા D) ત્રણ માસ

480. મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?
A) હિંસાનો ત્યાગ કરવો B) વૈજ્ઞાનિક માનસ કેળવવું
C) મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
D) આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.

481. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના ક્યા વર્ષમાં થયેલી હતી ?
A) 1964 B) 1965 C) 1966 D) 1970

482. ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?
A) નામદાર રાજ્યપાલશ્રી B) નામદાર રાષ્ટ્રપતિશ્રી
C) રાજ્ય D) ઉપર પૈકી બધા જ

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

483. ....ને મૂળભૂત હક.......ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.
A) યુનિયન બનાવવનો, 44 B) શોષણ વિરુદ્ધનો હક 43
C) મિલકત, 44 D) ખાનગી મિલકત, 42

484. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ ક્યા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે?
1. વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ
2. જાહેર વ્યવસ્થા
3. બદનક્ષી
4. અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
A) 1, 2 અને 4 B) 2 અને 3 C) 1, 3 અને 4 D) 1 2, 3 અને 4

485. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?
A) સંસદની B) વડાપ્રધાનની
C) મંત્રીમંડળની D) ઉપર પૈકી એકપણ નહી

486. કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ?
A) ક્વો વોરન્ટો B) હેબિયસ કોર્પસ
C) મેન્ડેમસ D) સર્ટિઓરરી

487. માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
A) 1949 B) 1999 C) 1870 D) 1993

488. બંધારણના ક્યા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે ?
A) અનુચ્છેદ-324 B) અનુચ્છેદ-329
C) અનુચ્છેદ-330 D) અનુચ્છેદ-325

489. રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
A) રાજ્યપાલ B) મુખ્યમંત્રી
C) ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ
D) વિધાનસભા અધ્યક્ષ

490. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ.....જ હોવા જોઈએ.
A) હાઈકોર્ટના નિવૃત્ત જજ
B) સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવના વકીલ
C) સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ
D) નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા

470)C, 471)A, 472)C, 473)B, 474)D, 475)B, 476)B, 477)A, 478)D, 479)A, 480)C, 481)A, 482)C, 483)C, 484)D, 485)C, 486)B, 487)D, 488)C, 489)A, 490)C.

491. યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે?
A) 30 B) 45 C) 90 D) 150

492. માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ?
A) 1991 B) 1999 C) 2000 D) 2005

493. કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે ?
A) 22 B) 30 C) 75 D) 53

494. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?
A) પ્રધાનમંત્રી B) રાષ્ટ્રપતિ
C) ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
D) ઉપરાષ્ટ્રપતિ

495. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
A) ન્યાયમૂર્તિ રંગાથ મિશ્રા B) ન્યાયમૂર્તિ ફાતમા બીબી
C) ન્યાયમૂર્તિ એસ.એસ.કાંગ D) ન્યાયમૂર્તિ વૈંકલ્યા

496. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે ?
A) ધારા-2 (ક) B) ધારા-2(ઘ) C) ધારા-3 D) ધારા-5

497. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ?
A) 6 અધ્યાય, 40 ધારા B) 8 અધ્યાય, 43 ધારા
C) 8 અધ્યાય, 42 ધારા D) 6 અધ્યાય, 43 ધારા

498. ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ?
A) 1972માં B) 1978માં C) 1976માં D) 1980માં

499. બંધારણ દિન ક્યારે આવે છે ?
A) 26મી નવેમ્બર B) 26મી જાન્યુઆરી
C) 15મી ઓગસ્ટ D) 3 જુલાઈ

500. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ?
A) 11 B) 182 C) 4 D) 26

501. મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ?
A) અનુચ્છેદ-20 B) અનુચ્છેદ-20 એ
C) અનુચ્છેદ-21 D) અનુચ્છેદ-21 એ

502. જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે?
A) 12 વર્ષ B) 14 વર્ષ C) 16 વર્ષ D) 18 વર્ષની નીચે (ગંભીર ગુનાના કેસમાં 16 વર્ષ)

503. રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ?
A) 15 B) 10 C) 7 D) 5

504. હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ?
A) 2 B) 4 C) 5 D) 6

505. રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો ?
A) 1990 B) 1992 C) 1995 D) 1998

506. 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ક્યા વર્ષમાં ઘડાયા ?
A) 1990 B) 1991 C) 1998 D) 1995

507. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન ક્યા કેસના આધારે થયું ?
A) વી.એન.ગોધાવર્દન B) ઈન્દ્રસ્વાહનેય કેસ
C) સમતા જજમેન્ટ D) વિશાખા જજમેન્ટ

508. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
A) જસ્ટીસ શ્યામસુંદર B) જસ્ટીસ આર.એન.પ્રસાદ
C) જસ્ટીસ બી.એલ.યાદવ D) જસ્ટીસ બાબર

509. લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને'.......... સાથે સરખાવ્યા છે.
A) પંચાયતી રાજ B) પંચાયત
C) ધારાસભા D) ધારાસભ્યો

510. ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ.........માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.
A) 20 B) 30 C) 40 D) 45

511. શહેરી સ્થાનિક સ્વરાજના ત્રિસ્તરીય માળખાને તેના સરકારી પ્રતિનિધિઓ સાથે જોડો.

1) મહાનગરપાલિકા	A) ચીફ ઓફિસર
2) નગરપાલિકા	B) તલાટી મંત્રી
3) નગર પંચાયત	C) મ્યુનિસિપલ કમિશનર

A) 1-a, 2-b, 3-c B) 1-b, 2-a, 3-c
C) 1-c, 2-b, 3-a D) 1-c, 2-a, 3-b

512. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?
A) વિજયાલક્ષ્મી પંડિત B) પ્રતિભા પાટીલ
C) ઈન્દિરા ગાંધી D) સુચેતા કૃપલાણી

513. રાજકીય હકોમાં ક્યા અધિકારોનો સમાવેશ થાય છે ?
A) મતાધિકાર B) ચૂંટણી લડવાનો અધિકાર
C) સરકારી નોકરી મેળવવાનો D) ઉપર્યુક્ત તમામ

514. કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે?
A) વડાપ્રધાન B) રાષ્ટ્રપતિ C) મુખ્યમંત્રી D) રાજ્યપાલ

515. PIL (પી.આઈ.એલ.) શું છે ?
A) પબ્લિક ઈસ્યુ લિસ્ટીંગ B) પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો
C) પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ D) પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

516. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?
A) વડાપ્રધાન B) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
C) ઉપરાષ્ટ્રપતિ D) રાષ્ટ્રપતિ

517. ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?
A) આદિવાસી વિસ્તારો B) જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર
C) હિમાલયના પહાડી વિસ્તાર D) જંગલ વિસ્તાર

491)A, 492)B, 493)A, 494)B, 495)A, 496)B, 497)B, 498)C, 499)A, 500)D, 501)D, 502)D, 503)D, 504)D, 505)B, 506)D, 507)B, 508)B, 509)C, 510)C, 511)D, 512)B, 513)D, 514)B, 515)D, 516)D, 517)A.

518. ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?
A) કાકાસાહેબ કાલેલકર B) જગજીવન રામ
C) ડૉ. બાબાસાહેબ આંબેડકર D) ડૉ. કે. એમ. મુનશી

519. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના ક્યા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?
A) 20(1) અને 22(1) B) 14 (4) અને 16(4)
C) 18(1) અને 19(1) D) 28(1) અને 29(1)

520. 'એમિક્સ ક્યુરી'નો અર્થ શું થાય છે ?
A) કાયદાકીય સલાહકાર B) ન્યાયવિદ્
C) કોર્ટનો મિત્ર D) સરકારી વકીલ

GPSC Class - 2 - 5/3/2017

521. કેન્દ્રીય માહિતીપંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ?
A) 7 B) 8 C) 9 D) 10

522. સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બન્ને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?
A) લોકસભાનાં અધ્યક્ષશ્રી B) લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
C) રાજ્યસભાનાં ચેરમેનશ્રી D) કાયદામંત્રીશ્રી

523. મા. ગર્વનરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?
A) મા. રાષ્ટ્રપતિશ્રી B) મા. વડાપ્રધાનશ્રી
C) મા. કાયદામંત્રી
D) મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઈકોર્ટ

524. ભારતમાં બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ ક્યા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ?
A) ઈંગ્લેંડ B) અમેરિકા C) જર્મની D) ઓસ્ટ્રેલિયા

525. 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?
A) મૂળભૂત હક્કો B) ચૂંટણી અંગે સુધારાઓ
C) આમુખ D) મિલ્કત ધરાવવાનો અધિકાર

526. સંવિધાનના આર્ટીકલ 40 (Article-40)માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?
A) કામદારો માટે નિર્વાહ વેતન
B) ગ્રામ પંચાયતની રચના
C) ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
D) ખેતી અને પશુપાલનની વ્યવસ્થા

527. નાણા બીલ (Money Bill) કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે?
A) રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)
B) માત્ર લોકસભામાં
C) માત્ર રાજ્યસમાભા
D) રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં

528. રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે?
A) 4 વર્ષ B) 5 વર્ષ C) 6 વર્ષ D) [illegible]

529. લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ [illegible] રહે તે માટે બંધારણનાં ક્યા આર્ટીકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ?
A) 330 B) 331 C) 332 D) 333

530. "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનાં રીપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?
A) 148 B) 149 C) 150 D) 151

531. બંધારણમાં કેટલી અનુસૂચિઓ (Schedules) આમેજ કરવામાં આવેલી છે ?
A) 10 B) 11 C) 12 D) 13

532. ચૂંટણી દરમ્યાન પ્રતીકની ફાળવણી કોણ કરે છે ?
A) ઈલેકશન કમિશન B) લોકસભાના અધ્યક્ષ
C) રાજ્યસભાના અધ્યક્ષ D) કાયદા મંત્રીશ્રી

GPSC Class - 2 - 11/12/2016

533. 'એમિક્સ ક્યુરી'નો અર્થ શું થાય છે ?
A) કાયદાકીય સલાહકાર B) ન્યાયવિદ્
C) કોર્ટનો મિત્ર D) એકપણ નહીં

534. 'નાગરિકત્વ'ની સમજૂતી ભારતના બંધારણના ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે ?
A) પાંચ B) છ C) સાત D) આઠ

535. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણનાં ક્યા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે ?
A) 19(A) B) 19(B) C) 19(C) D) 19(D)

536. બંધારણના આમુખમાં ક્યો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?
A) 42મો સુધારો તા. 3-1-1977
B) 42મો સુધારો તા. 1-4-1977
C) 42મો સુધારો તા. 1-1-1977
D) 42મો સુધારો તા. 1-7-1977

537. 'ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી' આ જોગવાઈ બંધારણમાં ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
A) 51-A-B B) 51-A-A C) 51-A-D D) 51-A-C

538. 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે ?
A) 52 B) 53 C) 54 D) 55,

539. નામ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ?
A) 60 વર્ષ B) 62 વર્ષ C) 58 વર્ષ D) 65 વર્ષ

518)A, 519)B, 520)C, 521)D, 522)A, 523)D, 524)B, 525)C, 526)B, 527)B, 528)C, 529)B, 530)D, 531)C, 532)A, 533)C, 534)A, 535)D, 536)A, 537)C, 538)A, 539)D.

540. ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને ક્યા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલી છે?

A) 324(1) B) 324 (2) C) 324(3) D) 324 (4)

541. જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે ?

A) 316 B) 317 C) 315 D) 318

542. રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

A) મા.ગવર્નરશ્રી B) મા.મુખ્યમંત્રીશ્રી

C) મા.કાયદામંત્રી D) મા.મુખ્યન્યાયાધીશશ્રી

543. 'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ?

A) National information and Technology institute.

B) National institution for trading and investment Aayog

C) National institution for Transforming india Aayog.

D) National Information for Transforming India Aayog

GPSC Class - 2 - 05/02/2017

544. બંધારણમાં આપણા દેશનો ક્યા નામે સ્વીકાર થયેલ છે?

A) ભારત B) ઈન્ડિયા

C) ઈન્ડિયા અને ભારત D) ઈન્ડિયા એટલે કે ભારત

545. રાજ્ય, છ થી ચૌદ વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેની મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો?

A) 80 B) 82 C) 86 D) 85

546. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ "અનુચ્છેદ-43બ" વર્ષ 2011 માં ઉમેરવામાં આવેલ છે કે રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે?

A) 90 B) 97 C) 96 D) 95

547. ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ ક્યા ભાગમાં આપવામાં આવેલી છે?

A) ભાગ-3 B) ભાગ-4 C) ભાગ-2 D) ભાગ-4ક

548. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહિ એવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

A) 31 ક B) 33 C) 31 ખ D) 31 ઘ

549. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ - 51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો?

A) 41 મો B) 42 મો C) 43 મો D) 44 મો

550. સંસદમાં ક્યા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી?

A) કૃષિ વિષયક B) નાણાં વિષયક

C) સંરક્ષણ વિષયક D) શિક્ષણ વિષયક

551. સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે?

A) અનુચ્છેદ - 75 B) અનુચ્છેદ - 85 અને 87

C) અનુચ્છેદ - 117 D) અનુચ્છેદ - 111

552. સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યાપ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ....તરીકે ઓળખવામાં આવે છે?

A) અનુસૂચિત જનજાતિઓ B) અનુસૂચિત જાતિઓ

C) અન્ય પછાત વર્ગો D) ઉપર પૈકી એકપણ નહી

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

553. રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?

A) સંસદને બોલાવવી-મુલત્વી રાખવી

B) સંસદને બેઠકને સંબોધવી

C) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો.

D) નિયુક્તિ-વડાપ્રધાન-અન્ય પ્રધાનો

554. બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે?

A) મૂળ સત્તા B) વિવાદ કે અપીલની સત્તા

C) સલાહ આપવાની સત્તા D) ઉપર પૈકી એકપણ નહી.

555. દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

A) અનુચ્છેદ-215 B) અનુચ્છેદ-216

C) અનુચ્છેદ-214 D) અનુચ્છેદ-217

556. નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી?

A) દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી

B) દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો.

C) સૈન્ય અદાલતની સજા માફ કરવી

D) દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો.

557. રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે?

A) 243 B) 244 C) 245 D) 246

540)A, 541)A, 542)A, 543)C, 544)D, 545)C, 546)B, 547)A, 548)D, 549)B, 550)B, 551)D, 552)B, 553)D, 554)A, 555)C, 556)C, 557)B.

558. ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઊજવવાનું નક્કી થયું છે?
A) 3જી જાન્યુઆરી B) 11મી જાન્યુઆરી
C) 16મી જાન્યુઆરી D) 9મી ફેબ્રુઆરી

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

559. બંધારણીય ઉપયોમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિવ્યુ કરી શકે અને હાઈકોર્ટનો નિર્ણય રદ કરી શકે ?
A) હેબીયસ કોર્પસ B) સર્ટીઓરરી
C) મંડમુસ D) પ્રોહિબીશન

560. બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને ક્યા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?
A) કલ્યાણકારી રાજ્ય B) આધુનિક રાજ્ય
C) ઉદામતવાદી રાજ્ય D) મૂડીવાદી રાજ્ય

561. રાષ્ટ્ર ગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય ક્યો છે ?
A) 45 સેકંડ B) 52 સેકંડ
C) 1 મિનીટ D) 1 મિનીટ 5 સેકંડ

562. ભારત ગણતંત્ર ક્યારે બન્યું ?
A) 1946 B) 1947 C) 1949 D) 1950

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

563. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
A) 26 જાન્યુઆરી, 1950 B) 15 ઓગસ્ટ, 1947
C) 26 નવેમ્બર, 1949 D) 14 સપ્ટેમ્બર, 1949

PSI LAW કાયદો - 4-3/5-3/2017

564. લોકસભાના અધ્યક્ષ કોણ છે ?
A) રાષ્ટ્રપતિ B) સંસદીય બાબતોના પ્રધાન
C) સ્પીકર D) ઉપરાષ્ટ્રપતિ

565. ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ?
A) ભારતીય પ્રધાનમંત્રી B) ભારતના રાષ્ટ્રપતિ
C) સુરક્ષામંત્રી D) સેનાધ્યક્ષ

566. રાજ્યસભાનો સભ્યનો કાર્યકાળ :
A) 5 વર્ષનો હોય છે.
B) 6 વર્ષનો હોય છે.
C) 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થય
D) જેમ લોકસભામાં છે એમ

567. ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?
A) ડૉ.બી.આર.આંબેડકર B) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
C) કે.એમ.મુનસી D) આપેલમાંથી કોઈ પણ નહીં

568. નીચનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ છે ?
A) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ
B) ભારતીય ચૂટણી પંચ
C) સંઘ લોક સેવા આયોગ (UPSC)
D) ઉપરના તમામ

569. ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ?
A) હિન્દી B) અંગ્રેજી
C) હિન્દી અને અંગ્રેજી D) હિન્દી, ઉર્દુ, સંસ્કૃત અને અંગ્રેજી

570. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
A) 26 જાન્યુઆરી 1950 B) 15 ઓગષ્ટ 1948
C) 10 નવેમ્બર 1950 D) 02 ઓક્ટોબર 1950

571. ભારતીય બંધારણમાં ક્યા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?
A) સંપત્તિ હક્ક B) સ્વતંત્રતાનો હક્ક
C) શોષણ વિરોધી હક્ક D) સમાનતાનો હક્ક

572. નીચેનામાંથી ....ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે?
A) લોકસભા B) રાજ્યસભા
C) વિધાનસભા D) વિધાનસભા

573. રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ?
A) ભારતના રાષ્ટ્રપતિ B) રાજકીય પક્ષોના પ્રમુખ
C) ભારતીય ચૂટણી પંચ D) આપેલામાંથી કોઈપણ નહીં

574. ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ?
A) 25 B) 21 C) 31 D) 41

575. કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?
A) જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
B) જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
C) જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
D) આપેલામાંથી કોઈપણ નહીં

576. નીચેનામાંથી ક્યા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધુ છે ?
A) નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મીંગ ઈન્ડિયા
B) પ્લાનીંગ અને ડવલોપમેન્ટ બોર્ડ
C) પરિવર્તન આયોગ
D) આપલામાંથી કોઈ પણ નહીં

577. નીચેનામાંથી ....અખીલ ભારતીય સેવા નથી ?
A) ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વીસ
B) ઈન્ડિયન પોલીસ સર્વીસ
C) ઈન્ડિયન રેવન્યુ સર્વીસ
D) ઈન્ડિયન ફોરેસ્ટ સર્વીસ

558)A, 559)B, 560)A, 561)B, 562)D, 563)A, 564)C, 565)B, 566)B, 567)A, 568)D, 569)A, 570)A, 571)A, 572)A, 573)C, 574)C, 575)B, 576)A, 577)C.

578. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો :
A) અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
B) અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
C) માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
D) સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.

579. રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે ?
A) 70 વર્ષ B) 75 વર્ષ
C) 80 વર્ષ D) કોઈ વય મર્યાદા નથી

580. ભારતીય ચૂંટણી પંચ :
A) તે બહુ સભ્ય પંચ છે.
B) લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે જવાબદાર છે.
C) જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી કરવવા માટે જવાબદાર છે.
D) માત્ર (A) અને (B)

581. નીચેનામાંથી ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ?
A) દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
B) આંદામાન અને નિકોબાર
C) ગોવા D) લક્ષદ્વીપ

582. નીચેનામાંથી ભારતીય બંધારણનો ક્યો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ?
A) 16 B) 17 C) 18 D) 19

583. શિક્ષણનો અધિકાર તે :
A) મૂળભૂત અધિકાર છે. B) કાનૂની અધિકાર છે.
C) વહીવટી અધિકાર છે. D) કુદરતી અધિકાર છે.

584. ભારતીય રાષ્ટ્રપતિની ચુટણી કોણ કરે છે ?
A) સંસદના બંને ગૃહોના ચુંટાયેલા સદસ્યો
B) રાજ્ય વિધાનસભાના ચુંટાયેલા સદસ્યો
C) રાજ્યસભા અને વિધાન પરિષદના 10 % નોમિનેટેડ સદસ્યો
D) માત્ર (A) અને (B)

585. રાજયસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે ?
A) રાષ્ટ્રપતિ B) ઉપરાષ્ટ્રપતિ
C) વડાપ્રધાન D) નાણા પ્રધાન

586. ગુજરાતમાં કેટલા પોલીસ કમિશ્નર વિસ્તારો છે ?
A) 3 B) 4 C) 5 D) 6

587. ભારતીય બંધારણ નો ક્યો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ?
A) 111 B) 211 C) 311 D) 411

588. ભારતીય સંસદમાં ....સામેલ હોય છે .
A) લોકસભા અને રાજયસભા
B) લોકસભા, રાજયસભા અને વડાપ્રધાનનું કાર્યલય
C) લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ
D) લોકસભા, રાજયસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ

589. રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ?
A) 276 B) 326 C) 356 D) 406

590. કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
A) Habeas Corpus B) Mandamus
C) Prohibition D) Qua-Warranto

591. ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂંક કોણ કરે છે ?
A) રાજયના મુખ્યમંત્રી B) રાજયના રાજ્યપાલ
C) રાજયની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
D) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

592. ભારતીય બંધારણનો 42 મો સુધારો ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
A) 1972 B) 1976 C) 1979 D) 1981

593. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
A) 1951 B) 1952 C) 1953 D) 1954

594. 1975 ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?
A) વી.વી.ગીરી B) બી.ડી.જત્તી
C) એમ.હિદાયતુલ્લાહ D) ફકરુદ્દીન અલી અહેમદ

595. ક્યા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ?
A) 26 B) 36 C) 46 D) 56

ASI કાયદો - 03/05/2015

596. કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યા આપવામાં આવેલ છે ?
A) મૂળભૂત અધિકારો B) મૂળભૂત ફરજો
C) આમુખ D) રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો

597. કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ?
A) 356 B) 354 C) 352 D) 358

598. ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી?
A) જવાહરલાલ નેહરુ B) ડૉ.સચ્ચીદાનંદ સિન્હા
C) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ D) સી.રાજગોપાલાચારી

599. રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
A) 3 વર્ષ B) 6 વર્ષ C) 4 વર્ષ D) 5 વર્ષ

600. ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે ?
A) 7 B) 6 C) 5 D) 8

601. ક્યા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ?
A) રશિયા B) ભારત C) અમેરિકા D) બ્રિટન

578)B, 579)D, 580)D, 581)C, 582)B, 583)A, 584)D, 585)B, 586)B, 587)C, 588)C, 589)C, 590)A, 591)B, 592)B, 593)A, 594)D, 595)B, 596)C, 597)A, 598)B, 599)B, 600)B, 601)B.

602. મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના ક્યા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે.

A)41 B)51 એ C)51 D)41 એ

603. ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?

A)રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ

B)રાજ્યસભા, લોકસભા

C)લોકસભા D)કોઈનહિ

604. રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ?

A)સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત

B)35 વર્ષની ઉંમર

C)ભારતનો નાગરિક

D)સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ

605. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

A)રાજ્યસભાના સીનિયર સભ્ય

B)ઉપરાષ્ટ્રપતિ

C)રાષ્ટ્રપતિ

D)રાજ્યસભાના ચૂંટાયેલા નેતા

606. ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

A)આઠ મહિના B)છ મહિના

C)ચાર મહિના D)સમય નિશ્ચિત નથી

607. ભારતના ક્યા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ?

A)અરૂણાચલ પ્રદેશ B)ત્રિપુરા

C)સિક્કીમ D)જમ્મુ અને કાશ્મીર

608. ભારતીય બંધારણના ક્યા આર્ટીકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે ?

A)324 B)284 C)224 D)384

609. ભારતની સુપ્રિમકોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે ?

A)બંગાલી B)અંગ્રેજી C)હિન્દી D)તામીલ

610. નીચેનામાંથી હાલમાં ક્યું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે?

A)ઝારખંડ B)આંધ્ર પ્રદેશ C)તેલંગાના D)છત્તીસગઢ

611. ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે ?

A)રાષ્ટ્રપતિ B)કેબિનેટ C)વડાપ્રધાન D)ઉપરાષ્ટ્રપતિ

612. સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરીયાત હોય છે ?

A)30 B)25 C)21 D)35

613. ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે ?

A)16 નવેમ્બર, 1950 B)15 ઓગસ્ટ 1947

C)26 જાન્યુઆરી 1950 D)26 જાન્યુઆરી 1930

614. ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય ક્યું છે ?

A)ઓડીસા B)તમિલનાડુ C)ગુજરાત D)આંધ્ર પ્રદેશ

615. ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

A)સરદાર પટેલ B)જવાહરલાલ નેહરુ

C)સી.રાજગોપાલાચારી D)મહાત્મા ગાંધી

616. ભારતની બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે ?

A)16 B)12 C)10 D)20

617. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?

A)10 B)15 C)12 D)8

618. નાગરિકતા વિશે ભારતીય બંધારણના ક્યા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

A)તૃતીય B)દ્વિતીય C)પ્રથમ D)ચતુર્થ

619. ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે?

A)22 B)18 C)12 D)24

620. યુનિયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોનકરન્ટ લીસ્ટનો ભારતીય બંધારના ક્યા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

A)6 B)5 C)4 D)7

621. પંચાયતી રાજની સૌપ્રથમ શરુઆત ક્યા રાજ્યમાં કરવામાં આવી છે ?

A)મધ્ય પ્રદેશ B)રાજસ્થાન C)ગુજરાત D)પંજાબ

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

622. ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

A)9 ડિસેમ્બર 1946 B)26 નવેમ્બર 1949

C)26 જાન્યુઆરી 1950 D)એકેય નહીં

PSI LAW કાયદો - 4/5/2015

623. નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂંક કરવામાં આવતી નથી?

A)વડાપ્રધાન B)મુખ્ય ચુટણી કમિશ્નર

C)ચીફ જસ્ટીસ D)મુખ્યમંત્રી

624. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે?

A)સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ B)લોકસભાના સ્પીકર

C)રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર D)વડાપ્રધાન

625. સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?

A)રાષ્ટ્રપતિ B)ઉપરાષ્ટ્રપતિ

C)લોકસભાના સીનીયર સભ્ય D)વડાપ્રધાન

626. ભારતીય બંધારણના ક્યા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે?

A)280 B)380 C)353 D)253

602)B, 603)A, 604)D, 605)B, 606)B, 607)D, 608)A, 609)B, 610)C, 611)A, 612)B, 613)C, 614)D, 615)C, 616)B, 617)C, 618)B, 619)A, 620)D, 621)B, 622)A, 623)D, 624)A, 625)C, 626)A.

627. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે?

A)4 B)8 C)10 D)12

628. ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે?

A)સાદી બહુમતીથી B) 2/3 બહુમતીથી

C) 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજયોની સંમતિથી

D)ઉપરના તમામ

629. ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે?

A)41 B)44 C)48 D)54

630. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે?

A)5% B)10% C) 15% D)20%

631. ભાષાવાર રાજયોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ?

A)1951 B)1955 C)1956 D)1961

632. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું?

A)લાલ કૃષ્ણ અડવાણી B) ચૌધરી ચરનસિંહ

C) ગુલઝારીલાલ નંદા D) બાબુ જગજીવનરામ

633. કોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ (સી.એ.જી) ની નિમણુંક કોણ કરે છે.

A)વડાપ્રધાન B) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

C) ઉપરાષ્ટ્રપતિ D) રાષ્ટ્રપતિ

634. કેન્દ્ર સરકાર કે રાજય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનીસ્ટર) રાખી શકે છે?

A) 15% B)20% C)10% D)5%

635. પ્રધાનો (મિનીસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો?

A)90મો B)91મો C) 92મો D) 93મો

636. ચુંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકે છે?

A)વડાપ્રધાન B) રાષ્ટ્રપતિ

C) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ D) ચીફ ચુંટણી કમિશ્નર

637. કેન્દ્ર સરકારના કાયદા અને રાજય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે?

A) કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.

B) રાજય સરકારનો કાયદો સર્વોપરી છે.

C) સુપ્રિમ કોર્ટ નિર્ણય લે છે.

D) રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.

638. ભારતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે?

A)92 B)95 C)100 D)98

639. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂંક કરવાની સત્તા છે?

A)2 B)5 C) 12 D) સત્તાનથી

640. મહાભિયોગ પધ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી?

A) વડાપ્રધાન B) રાષ્ટ્રપતિ

C) ઉપરાષ્ટ્રપતિ D) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

641. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં .... વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. (ખાલી જગ્યા પૂરો)

A) 25 B) 30 C) 28 D) 35

GSSSB મિકેનિક - 2017

642. વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ?

A)સંસદ B)ન્યાયતંત્ર C)સરકાર D)ચૂંટણીપંચ

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

643. સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

A) પ્રધાનમંત્રી B) રાષ્ટ્રપતિને

C) લોકસભાના અધ્યક્ષને D) રાજ્યસભાના અધ્યક્ષને

644. "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે."

A) જસ્ટીસ ભગવતી પંચ B) કોઠારી પંચ

C) ચાગેલા પંચ D) નાણાંવટી પંચ

GSSSB સર્વેયર - 2016-17

645. 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ?

A) 1999 B) 1997 C) 1998 D) 1996

646. કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ?

A) 1962 B) 1960 C) 1958 D) 1956

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

647. કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે?

A) અનુચ્છેદ 20,21 B) અનુચ્છેદ 20,22

C) અનુચ્છેદ 19,20 D) અનુચ્છેદ 19,21

648. સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

A) 79 B) 78 C) 80 D) 81

649. 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરૂષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

A) 325 B) 324 C) 323 D) 326

627)B, 628)D, 629)B, 630)B, 631)C, 632)C, 633)D, 634)A, 635)B, 636)D, 637)A, 638)C, 639)A, 640)A, 641)D, 642)A, 643)B, 644)C, 645)D, 646)D, 647)A, 648)A, 649)D.

650. સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે?

A) 9 B) 10 C) 11 D) 12

651. રાજ્ય, પર્યાવરણનું જતન અને એમા સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે?

A) 42માં B) 44માં C) 45માં D) 46માં

652. સર્વોચ્ચ અદાલતનાં પ્રથમ મહિલા ન્યાયાધિશ કોણ હતા?

A) સુજાતા રાવ B) આર.ભાનુમતિ

C) જ્ઞાનસુધા મિશ્રા D) ફાતિમાં બીબી

653. ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013 અનુસાર લોકાયુકત તરીકે નિમાયેલ વ્યકિત પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ....વર્ષની મુદ્દત સુધી અથવા ....વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.

A) 5, 62 B) 6, 65 C) 5, 72 D) 5, 70

654. ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે?

A) રાજ્યની યાદી B) સંયુક્ત યાદી

C) સંઘની યાદી D) ઉપર પૈકી એક પણ નહી

મુખ્ય સેવિકા - 8/1/2017

655. લેખાનુદાન એટલે શું ?

A) ધારાગૃહ જે મંજૂરી આપે તે

B) નાણાં ખરડાને મંજૂરી અપાય તે

C) નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે.

D) એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે

656. નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

A) નાણાં ખરડાને પસાર કરવા માટે

B) નાણાં ખરડાને મંજૂર કરવા માટે

C) બજેટ બનાવવા માટે

D) કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે

વિસ્તરણ અધિકારી - 7/1/2017

657. ભારતનાં બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?

A) 74 મો B) 88 મો

C) 97 મો D) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

658. ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃતિ વય કેટલી છે?

A) 58 B) 620 C) 65 D) હોતી નથી

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

659. બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુંમતે સ્વીકાર્યું?

A) માગસર વદ 8, વિક્રમ સંવત 2006

B) માગસર સુદ 7, વિક્રમ સંવત 2006

C) માગસર સુદ 5, વિક્રમ સંવત 2006

D) કારતક સુદ 7, વિક્રમ સંવત 2006

660. ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે?

A) સત્યેમેવ જયતે B) જયહિંદ

C) જન ગણ મન D) વંદે માતરમ્

661. કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો?

A) ચાર્ટર એક્ટ - 1813 B) પિટનો ધારો

C) ચાર્ટર એક્ટ - 1853 D) ચાર્ટર એક્ટ - 1833

662. ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કલમો હતી?

A) 8 અને 395 B) 12 અને 461

C) 10 અને 495 D) 9 અને 398

663. બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ?

A) કલ્યાણકારી રાજ્ય B) માર્ગદર્શક સિદ્ધાંતો

C) મૂળભૂત ફરજો D) મૂળભૂત હકો

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

664. જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાનારા સભ્યોની ચૂંટણી કોણ કરે છે ?

A) રાજ્ય ચૂંટણી પંચ B) વિકાસ કમિશ્નર

C) કલેક્ટર D) જિલ્લા વિકાસ અધિકારી

665. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ ?

A) ત્રણ માસ B) એક માસ C) એક વર્ષ D) છ માસ

666. 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

A) અનુચ્છેદ - 12 B) અનુચ્છેદ - 14

C) અનુચ્છેદ - 16 D) અનુચ્છેદ - 18

667. જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે?

A) 73 મો બંધારણ સુધારો

B) 74 બંધારણ સુધારો

C) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

D) આયોજન પંચની માર્ગરેખાઓ

668. ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારત કેટલામાં રાષ્ટ્રપતિ હતા ?

A) 11 મા B) 10 મા C) 9 મા D) 13 મા

650)C, 651)A, 652)D, 653)C, 654)B, 655)C, 656)D, 657)A, 658)D, 659)B, 660)A, 661)D, 662)A, 663)C, 664)C, 665)D, 666)B, 667)B, 668)A.

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

669. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક........ દ્વારા કરવામાં આવે છે ?
A) નાણા મંત્રી B) વડાપ્રધાન
C) રાષ્ટ્રપતિ D) એકપણ નહીં

670. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામુ પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?
A) રાષ્ટ્રપતિ B) લોકસભા અધ્યક્ષ
C) ચેરમેન D) પ્રધાનમંત્રી

671. રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ?
A) 148 B) 150 C) 151(1) D) 151(2)

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

672. બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
A) 25 જાન્યુઆરી, 1950 B) 26 જાન્યુઆરી, 1950
C) 24 જાન્યુઆરી, 1950 D) 29 જાન્યુઆરી, 1950

673. વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?
A) મુખ્યમંત્રી B) વિધાનસભા અધ્યક્ષ
C) નાયબ મુખ્યમંત્રી D) રાજ્યપાલ

674. વર્ષ 1687માં ભારતમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા કરવામાં આવી ?
A) મદ્રાસ B) બોમ્બે C) કલકત્તા D) દિલ્હી

675. રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?
A) લોકસભા બિલ પસાર કરે ત્યારે
B) રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
C) લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે
D) A, B અને C ત્રણમાંથી એકપણ નહી

676. રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં .... જરૂરી છે.
A) કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
B) હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
C) સામાન્ય સંમતિ
D) કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી

677. જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે?
A) 73મો બંધારણીય સુધારો
B) 74મો બંધારણીય સુધારો
C) રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
D) આયોજન પંચની માર્ગ રેખાઓ

678. કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના ક્યા મંત્રાલયને હસ્તક છે?
A) ગૃહ બાબતો B) નાણાં
C) ઉદ્યોગ અને ખનિજ D) કાનૂની બાબતો

679. ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?
A) વડાપ્રધાન B) કેબીનેટ મિનીસ્ટ્રી
C) રાષ્ટ્રપતિ D) લોકસભા અને રાજ્યસભા

680. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ?
A) કલમ-153 B) કલમ-155 C) કલમ-154 D) કલમ-156

TET-II -2017

681. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા બંધારણીય રીતે કોણ ધરાવે છે ? - રાષ્ટ્રપતિ

682. ભારતીય બંધારણમાં શિક્ષણની કઈ યાદીમાં સમાવેશ થાય છે ? - સંયુક્ત યાદી

HTAT - 2015

683. ભારતીય લોકસભા અને રાજ્યસભાની મહત્તમ બેઠકો અનુક્રમે કેટલી છે ? - 552 અને 250

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

684. એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના ક્યા સુધારા દ્વારા કરવામાં આવી ? - 7મો સુધારો

685. સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા.............. - ધારાકીય સત્તા છે.

686. સંવિધાનના 74 (ચુમોતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9Aથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ? - નગરપાલિકાઓ

687. રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? - 267(2)

688. ભારતના બંધારણના રખેવાળ(રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? - સર્વોચ્ચ અદાલત

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

689. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ? - નૈતિક સૂચનો છે.

690. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે ? - કોઈ ખરડાના મતભેદ થવાના પ્રસંગે

691. કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે ? - રાષ્ટ્રપતિ

692. વિરોધપક્ષના નેતાને લોકસભામાં ક્યા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે ? - કેબિનેટ મંત્રી

669)C, 670)A, 671)D, 672)C, 673)D, 674)A, 675)C, 676)D, 677)B, 678)A, 679)C, 680)B.

693. હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલાં વર્ષનો લઘુતમ અનુભવ જરૂરી છે ? - **10**

પોલીસ કોન્સ્ટેબલ - 2012

694. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? - **ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા**

695. રાજ્યનું ઉપલુ ગૃહ ક્યા નામથી ઓળખાય છે? - **વિધાન પરિષદ**

696. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? - રાજયપાલ

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

697. ભારતીય સંસદના 'ઉપલાગ્રહ' (રાજ્યસભા)ની મુદત કેટલી હોય છે ? - **કાયમીગૃહ**

698. આપણા બંધારણની શરૂઆત શાનાથી થાય છે ? - **આમુખ**

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

699. કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સત્તા ફક્ત.........ને હોય છે. - **સુપ્રિમ કોર્ટ**

પ્રોબેશન ઓફિસર - 2016

700. લોક અદાલત એ શું દર્શાવે છે ? - **ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે**

701. ભારતના સંવિધાનના ક્યા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું ? - **17**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

702. બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? - **ડૉ.રાજેન્દ્ર પ્રસાદને**

703. ભારતીય બંધારણના આમુખનું પ્રારુપ કોણે તૈયાર કર્યું હતું ? - **બંધારણીય સલાહકાર બી.એન.રાવ**

704. રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? - **રાજ્યપાલ**

705. રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? - **25**

706. કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? - **ચૂંટણી આયોગ**

707. લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? - **નિરપેક્ષ બહુમતી**

708. વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે ? - **29 રાજ્યો**

709. ડૉ.બાબાસાહેબ આંબેડકરે ક્યા હક્કને બંધારણનો આત્મા કહ્યો છે ? - **બંધારણીય ઈલાજોનો હક**

710. બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી ? - **બાળ ગંગાધર ટિળક**

711. રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી ? - **જુલાઈ, 1947**

712. રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે ? - **500**

મહેસૂલી તલાટી - 2014

713. રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? - **કોઈ નહીં**

714. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? - **પ્રથમ**

715. બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ? - **કલમ-343**

716. કાસ્ટિંગ વોટ એટલે શું ? - **બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત**

TET- II - ભાષા - 2015

717. રાજ્યમાં જિલ્લા ન્યાયધીશ (District Judge)ની નિમણૂક કોણ કરે છે? - **રાજ્યપાલ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

718. ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે? - **રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંતોની**

719. યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. - **રાજ્યનો બંધારણીય વડા : રાજયપાલ, મંત્રીમંડળના વહીવટી વડા : મુખ્યમંત્રી, વિધાનસભાનું સંચાલન કરનાર : સ્પીકર અધ્યક્ષ, ધારાસભ્ય : એમ.એલ.એ**

720. સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોનો જવાબદાર હોય છે ? - **લોકસભાને**

721. રાજ્યસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે ? - **6 વર્ષ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

722. રાજ્યસભામાંથી દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે ? - **એક તૃતિયાંશ**

723. ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે ? - **બંધારણનું આમુખ**

724. 'ચુંટણી ઓળખપત્ર' એ શાનો આધારભૂત દસ્તાવેજ છે ? - **નાગરિકત્વનો**

725. નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? - **રાષ્ટ્ર પ્રમુખ સામે 'મહાભિયોગ'ની કાર્યવાહી થઈ શકે છે, વિધાન પરિષદ કાયમી સંસ્થા છે, રાષ્ટ્ર પ્રમુખ નાણાકીય ખરડાને પરત મોકલી શકતા નથી.**

જૂનિયર કલાર્ક પેપર - 1 - 2012

726. ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? - **શ્રી નિયોગી**

727. ભારતના બંધારણના આમુખ ને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા ? - **કનૈયાલાલ મુનશી**

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

728. લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાંકિય નિવેદન ભારતના બંધારણના કયાં આર્ટિકલ અન્વયે રજૂ થાય છે ? - **112**

729. કોણ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા ? **- બી.એન. રાવ**

730. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે ? **- એટર્ની જનરલ**

731. ક્યાં મુકદમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ સંરચના સિધ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું ? **- કેશવાનંદ ભારતી વિરુધ્ધ કેરળ રાજ્ય**

732. ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષક (Guardian) કોણ ? **- ન્યાયપાલિકા**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

733. ચૂંટણીપંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? **- 324**

734. લોકસભાની મુદતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો છે? **- નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ**

735. બંધારણીય કટોકટી એટલે **- રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યમાં જાહેર કરાતી કટોકટી**

736. નઝીરી અદાલત એટલે **- વિવિધ કોર્ટોના ચુકાદા, કાયદાના અર્થઘટનો તથા સ્વીકારાયેલ પ્રણાલીઓના દસ્તાવેજોને સર્વોચ્ચ અદાલત દ્વારા સુરક્ષિત રાખવા**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

737. 'આમુખ' એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું ? **- પંડિત જવાહલાલ નેહરુ**

738. સંપત્તિ અને ઉત્પાદનનાં સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા અનુચ્છેદમાં છે ? **- અનુચ્છેદ-39**

739. નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા ક્યા કેસમાં 'અખબારી સ્વાતંત્ર્ય' વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે ? **- બેનેટ કોલમેન એન્ડ કું.વિ. યુનિયન ઓફ ઈન્ડિયા**

740. ભારતીય સંવિધાનના અનુચ્છેદ-51 (ક) (જ)માં ભારતના દરેક નાગરિકની કઈ ફરજનો નિર્દેશ થયો છે ? **- જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની**

741. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ક્યા સ્થળે મળેલ અધિવેશનમાં 'મૂળભૂત અધિકારો'ને બંધારણમાં સ્થાન આપવા ઠરાવ પસાર કર્યો હતો ? **- મદ્રાસ**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

742. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? **- નાણામંત્રી**

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

743. ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂંક કોણ કરે છે ? **- રાષ્ટ્રપતિ**

744. ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂંક કોણ કરે છે ? **- રાષ્ટ્રપતિ**

745. રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? **- વડાપ્રધાન**

746. રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ? **- રાજ્યપાલ**

TET- I - 2012/2014

747. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક માટે કોની સાથે વિચારણા કરવામાં આવે છે? **- રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ**

748. ભારત સરકારે રાષ્ટ્રીય પંચાગ ક્યારથી દાખલ કર્યું ? **- 22-3-1957**

749. ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહો હોય છે ? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે ? **- સંસદમાં બે ગૃહો હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે**

સબ ઓડિટર - 2015

750. ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા? **- વી. નરહરિ રાવ**

751. ભારતની કેન્દ્ર સરકારે દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણીય સુધારા વિધેયક છે ? **- 122મું**

સબરજિસ્ટ્રાર - 2013

752. ભારતસંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના ક્યાં પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ? **- પહેલા**

753. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ છે ? **- 444 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ**

754. સોલીસીટર જનરલ શું છે ? **- સરકાર પક્ષે કાનુની સલાહકાર**

755. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ? **- લોકસભા - 15 અને રાજ્યસભા - 7**

756. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બન્ને હોદ્દા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે ? **- સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ,**

757. આપણા બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ છે ? **- 5**

758. ક્યા ભારત સરકારના સર્વ પ્રથમ કાયદાકીય અધિકારી છે ? **- એટર્ની જનરલ**

759. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ? **- વડાપ્રધાન**

760. રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે ? **- ઉપરાષ્ટ્રપતિને**

761. 14મા નાણાંપંચના અધ્યક્ષ **- ડૉ. વાય.વી. રેડ્ડી**

762. ભારતના બંધારણના ક્યા ભાગમાં ''સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર'' ને ભારતના નાગરિકના મૂળભૂત હક્કો તરીકે સ્વીકારવામાં આવ્યા છે ? **- ત્રીજા ભાગ**

763. રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં છે ? **- 356**

764. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે ? **- રાષ્ટ્રપતિ**

PSI - 2012

765. આંદામાન નિકોબાર ટાપુ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે ? - **કોલકાતા**

PSI કાયદાકીય બાબતો - 2012

766. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવા નિવૃત્તિ થાય છે ? - **65 વર્ષે**
767. કોઈ વ્યક્તિને ગેરકાનુની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેનામાંથી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે? - **હેબિયસ કોર્પસ**
768. બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે ? - **22**
769. ભારતના બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા ? - **30**
770. ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે ? - **324**
771. બિન સાંપ્રદાયિકતા (Secularism) શબ્દ કયા બંધારણીય સુધારાથી ઉમેરાયેલ ? - **42 માં**
772. ભારતના સંવિધાનમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો ? - **મૂળભૂત ફરજો**
773. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે ? - **અનુ. 54**
774. ભારતના રાષ્ટ્ર પ્રમુખ. - **કાર્યકારિણીના વરિષ્ટ છે.**
775. રાષ્ટ્રપતિ રાજયસભાના કેટલા સભ્યો નિમે છે ? - **12**
776. મૂળભૂત અધિકારોનાં ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે ? - **વિભાગ ત્રણ**
777. રિટસ કેટલા પ્રકારની હોય છે ? - **પાંચ**
778. મેન્ડેમસ ની રિટ એટલે ? - **પરમાદેશ**
779. કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આવેલ છે ? - **અનુ. 311**
780. બંધારણમાં કેટલી પ્રકારની કટોકટીની સ્થિતિ અંગે જોગવાઈ થયેલી છે ? - **ત્રણ**
781. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની કડીરૂપ ભાષા (Link Language) નું સ્થાન બંધારણમાં ક્યા અનુચ્છેદ થી મળેલ છે ? - **346**
782. જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે કામ ચલાઉ જોગવાઈઓ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? - **370**
783. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે ? - **અમેરિકા**
784. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા ? - **ડૉ.બી.આર. આંબેડકર**
785. કયુ વાક્ય સાચુ છે ? - **નાયબ વડા પ્રધાનને બંધારણીય માન્યતા નથી, મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધીના મંત્રી મંડળમાં નાયબ વડા પ્રધાન હતા, સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન હતા.**
786. રાષ્ટ્રપતિને સંસદના કઈ જાતિના સભ્યોને નિયુક્ત કરવાની સત્તા છે ? - **રાજ્યસભામાં નિષ્ણાત વ્યક્તિઓ અને લોકસભામાં એંગ્લો ઈન્ડિયન્સ**
787. ભારતીય બંધારણની શું વિશિષ્ટતાઓ છે ? - **વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, એક જ નાગરિકતા દર્શાવેલી છે, સંઘાત્મક શાસન પ્રણાલી છે.**

PSI નશાબંધી - 2011

788. કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. - **ધારાસભ્ય તરીકે ગેરલાયક બને**
789. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવું પડે ? - **6 માસ**
790. કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે ? - **35**
791. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ... - **બંધારણીય પદ ધરાવે છે.**
792. બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? - **368**

એકાઉન્ટ ઓફિસર - 1999

793. ભારતમાં પ્રત્યેક વ્યક્તિને મતાધિકાર ક્યારે મળે ? - **18 વર્ષે**
794. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે ? - **રાજ્યપાલ**

આંકડાકીય અધિકારી - 2000

795. વંદે માતરમ્ ગીતના રચયિતા કોણ છે ? - **બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય**
796. ક્યા વર્ષે તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હતું ? - **1980**
797. ભારતીય બંધારણ સભાના પ્રથમ કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? - **ડૉ.સચ્ચિદાનંદ સિંહા**
798. ભારતીય બંધારણનો ક્યો સુધારો 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર આપે છે ? - **61મો સુધારો**
799. ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિથી લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું સ્થાન આપે છે ? - **અનુચ્છેદ 343**
800. ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે ? - **લોકસભા**
801. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ? - **રાષ્ટ્રપતિ**
802. ભારતમાં સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિનો હોદ્દો કોણે ભોગવ્યો - **ડૉ.રાજેન્દ્ર પ્રસાદ**
803. ક્યા બંધારણીય સુધારાથી ભારતમાં ભાષાકીય ધોરણે રાજ્યની પુનઃરચના શક્ય બની ? - **સાતમો સુધારો**
804. વડી અદાલત (હાઈકોર્ટ)ના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ? - **રાષ્ટ્રપતિ**
805. સંઘ સરકારની આવકોને જમા કરવામાં આવે છે ? - **સંઘનિધિમાં**

806. ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? - **કે.સી.નિયોગી**

807. દેશમાં કટોકટીની પરિસ્થિતિની જાહેરાત કોણ કરે છે ? - **રાષ્ટ્રપતિ**

આયુર્વેદિક ડૉક્ટર - 2000

808. સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં છે ? - **અનુચ્છેદ-14થી 18**

809. ક્રોસ વોટિંગ એટલે શું ? - **પક્ષના આદેશને અવગણીને મત આપવો.**

810. ભારત સરકારના બંધારણીય વડા કોણ ગણાય ? - **રાષ્ટ્રપતિ**

811. સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેટલા સમય સુધી કેન્દ્રીય પ્રધાન પદે રહી શકે ? - **6 મહિના**

812. ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલા આદેશને શું કહેવાય ? - **ઓર્ડિનન્સ (વટહુકમ)**

813. સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ? - **રાષ્ટ્રપતિ**

814. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે ? - **ડૉ.આંબેડકર**

815. ભારતમાં કઈ બાબત આધારે મતાધિકાર અપાયો છે ? - **ઉંમર**

816. ભારતીય ત્રિરંગાની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે ? - **3:2**

વૈદકિય સેવા - 2000

817. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય ? - **વડાપ્રધાન**

818. લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર જોઈએ ? - **25 વર્ષ**

819. ક્યા વડાપ્રધાનના સમયમાં સૌથી વધુ બંધારણીય સુધારા થયા ? - **ઈન્દિરા ગાંધી**

820. રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ? - **રાષ્ટ્રપતિ**

821. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય મર્યાદા કેટલા વર્ષની છે ? - **65 વર્ષ**

કાયદા અધિકારી - 2000

822. રાજ્યના વહીવટી વડા કોણ છે ? - **રાજ્યપાલ**

823. વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે છે ? - **રાષ્ટ્રપતિ**

824. બંધારણની 356મી કલમ કેન્દ્ર સરકારને કઈ સત્તા આપે છે ? - **કેન્દ્રની સૂચના અવગણતા રાજ્ય સરકારની બરતરફી**

825. પાડોશી દેશના આક્રમણ સમયે લડાઈ ચાલુ કરવાનો આદેશ કોણ આપે છે ? - **રાષ્ટ્રપતિ**

826. ગુલેટીન શું છે ? - **ખરડા પર મતદાનનો સમય નક્કી કરી ચર્ચાને ટૂંકાવવાની પદ્ધતિ.**

827. ભારતની રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા જણાવો. - **250**

828. શ્વેતપત્ર શું છે ? - **રાષ્ટ્રીય મહત્ત્વની બાબતે જાહેર કરેલો દસ્તાવેજ**

829. ભારતમાં ક્યા વર્ષે કટોકટી લાદવામાં આવી ? - **1975**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

830. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે બનાવી હતી ? : **પિંગલી વેંકૈયા**

831. વિશ્વમાં ભારતનું બંધારણ ક્યા પ્રકારનું મનાય છે ? : **સૌથી મોટું લેખિત બંધારણ**

832. સીધી ચૂંટણી લડ્યા સિવાય સંસદના ક્યા ગૃહના સભ્ય બની શકાય ? : **રાજ્યસભા**

833. સંસદના ક્યા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી ? : **રાજ્યસભા**

834. રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને ? : **રાજ્યપાલ**

835. ભારતની રાષ્ટ્રભાષા કઈ લિપિમાં લખાય છે ? : **દેવનાગરી**

836. ભારતીય સંઘના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? : **સંસદના બંને ગૃહના સભ્યો**

837. કોની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવે છે ? : **રાજ્યપાલ**

838. બંધારણના ક્યા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થયા ? : **26મા સુધારાથી**

839. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? : **સુકુમાર સેન**

840. કોઈપણ નાણાંકીય ખરડાને પસાર કરતાં પૂર્વે કોની મંજૂરી જરૂરી છે ? : **રાષ્ટ્રપતિ**

841. દેહાંતદંડની સજા માફ કરવાની દયા અરજી કોને કરવાની હોય ? : **રાષ્ટ્રપતિ**

842. રાષ્ટ્રપતિના ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય ? : **લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો**

843. ક્યા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદ્દત 6 વર્ષની કરવામાં આવી ? : **ઈન્દિરા ગાંધી**

844. સંઘની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ? - **રાષ્ટ્રપતિ**

845. ક્યા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો ? : **42મો સુધારો**

846. રાજ્ય સરકારને કઈ કલમ અનુસાર પંચાયત સ્થાપવાની સત્તા છે ? : **અનુચ્છેદ - 40**

847. નાણાંપંચની રચના દર કેટલા વર્ષે થાય છે? : **5 વર્ષ**

848. ભારતના ક્યા રાજ્યને અલગ બંધારણ છે ? : **જમ્મુ-કાશ્મીર**

849. ભારતનું કયું રાજ્ય લોકસભાની સૌથી વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? : **લોકસભા**

850. ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના ક્યારે થઈ ? : **1956**

851. સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ છે? : **ફાતીમા બીબી**

852. વિરોધ પક્ષના નેતા કોની સમકક્ષ ગણાય ? : **કેબિનેટ મંત્રી**

853. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી ? : **એમ. હિદાયતુલ્લા**

854. આપણા બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક્ક આપતો અનુચ્છેદ - 21 ક ક્યા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે ? : **86 મો બંધારણીય સુધારો - 2002**

855. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હશે અને બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી, આ અનુચ્છેદ... - **અનુચ્છેદ-64**

856. બંધારણના ક્યા સુધારાથી સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલા લેવાનું ફરજિયાત બન્યું ? - **42મો સુધારો**

857. શ્રી રામનાથ કોવિંદ એ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે ? : **14મા**

858. 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? : **રૂ. 20,000 કરોડ**

859. અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? : **આર્ટિકલ - 28**

860. વહીવટી સુધારા પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી ? : **1966**

861. સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? : **સંસદને**

862. ક્યા બંધારણીય સુધાર અંતર્ગત અનુચ્છેદ 54મા ઉલ્લેખીત 'રાજ્યો' શબ્દને પુનઃ વ્યાખ્યાયિત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન ક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું ? - **બંધારણ (70મો સુધારો) અધિનિયમ, 1992**

863. સુપ્રીમ કોર્ટની દિલ્હી અથવા રાષ્ટ્રપતિની મંજૂરીથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે સ્થળે નક્કી કરે તે સ્થળે બેઠક થઈ શકશે.- **અનુચ્છેદ-130**

864. સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? : **કાયદો કહેવાય**

865. કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? : **આર્ટિકલ - 24**

866. ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષયનો સમાવેશ ....માં કરવામાં આવ્યો છે. - **સમવર્તી યાદી**

867. સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? : **કાયદો કહેવાય**

868. ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે ? : **રાષ્ટ્રપતિ**

869. કઈ સંસ્થાએ 'ક્રિમીલેયર'નો ખ્યાલ આપ્યો ? - **ભારતની સર્વોચ્ચ અદાલત**

870. યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય ? : **અધિકાર પૃચ્છા**

871. બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? : **જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય**

872. મત વિસ્તારોનું હાલનું સિમાંકન 2001ની વસતી ગણતરીના આધારે છે, મત વિસ્તારોના હવે પછીના સિમાંકનની રચના ક્યા આધારે કરવામાં આવશે ? - **2026 પછીની પ્રથમ વસતી ગણતરી**

873. અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી જાહેર કરવાની સત્તા કોની પાસે છે ? - **રાષ્ટ્રપતિ**

874. ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન... - **પોતાને લોકો દ્વારા આપવામાં આવે છે.**

875. અન્ય ધર્મ અંગિકાર કરે તે અનુસૂચિત જાતિનો દરજ્જો જાળવી શકે નહીં - આ વિધાન ? - **સાચું છે.**

876. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક ....કાર્ય કરે છે. - **ફક્ત ઓડિટ**

877. ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચે વિવાદ સુપ્રીમ કોર્ટના ક્યા અધિકાર ક્ષેત્રમાં આવે છે ? - **મૂળભૂત અધિકાર ક્ષેત્ર**

878. ચૂંટણીઓની દેખરેખ, દોરવણી અને નિયંત્રણની જવાબદારી ચૂંટણી આયોગની બાબતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-324**

879. કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ ક્યો છે ? - **અમૂક મૂળભૂત સુવિધાઓ સુધારી શકાતી નથી.**

880. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં ક્યા વ્યક્તિનો સમાવેશ થાય છે ? - **તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટેનન્ટ ગવર્નરો**

881. રાજ્યપાલના મળતરો અને ભથ્થા શેમાંથી ઉધારવામાં આવશે ? - **જે તે રાજ્યના એકત્રિત ફંડમાંથી**

882. ગુજરાત પંચાયત ધારો ગોચર પરનુંદબાણ હટાવવા ઉપયોગી થાય, આ વિધાન ? - **સત્ય છે.**

883. સશસ્ત્ર દળોનો વહીવટ અને કામગીરીને લગતું નિયંત્રણ.......દ્વારા થાય છે. - **રક્ષા મંત્રાલય**

884. રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-316**

885. સંસદમાં નાણાં વિધેયક માત્ર ક્યા રજૂ કરી શકાય ? - **લોકસભા**

886. વજન અને માપના ધોરણો સ્થાપવા કઈ યાદીનો વિષય છે ? - **સંઘ યાદી**

887. ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ ? - **અદાલતનો આશરો લઈ શકાતો નથી**

888. ભારતીય સંવિધાનના પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની જોગવાઈઓ.......... માટે કરાઈ છે. - **અનુસૂચિત જનજાતિઓના હિતોનું રક્ષણ કરવા**

889. જ્યા લશ્કરી ન્યાયાલયે શિક્ષા કરી હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ.... - **સજા માફ કરી શકે**

890. ભારતના નાણાકીય સમાવય તંત્રના સંતુલન ચક્ર તરીકે કાર્ય કરશે ? - **નાણાં પંચ**

891. મૂળભૂત કર્તવ્યો નાગરિકો માટે ... **ફરજિયાત છે.**

892. હાલ સુધીમાં ભારતમાં કેટલા સીમાંકન આયોગની સ્થાપના થઈ છે ? - **4**

893. સંસદમાં ક્યા ગૃહને નાણા વિધેયકનો સ્વીકાર કે સુધારો કરવાની સત્તા નથી ? - **રાજ્યસભા**

894. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ ભાગ માટે કોઈપણ નિયમ બનાવી શકે છે. - **કોઈપણ રાજ્યની સંમતિ વગર**

895. મત્સ્ય ક્ષેત્ર કઈ યાદીનો વિષય છે ? - **રાજ્યયાદી**

896. સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે શિક્ષા થઈ હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ........ - **સજા માફ કરી શકે**

897. વિલ ભારતીય બંધારણની કઈ યાદીમાં સમાવિષ્ટ છે ? - **સમવર્તી યાદી**

898. સંસદના અમુક વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તે કોણે નક્કી કરવાનું હોય છે ? - **લોકસભા અધ્યક્ષ**

899. રાજ્ય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? - **રાજ્યપાલ**

900. કેન્ટોનમેન્ટ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીની નિમણૂક........ દ્વારા કરવામાં આવે છે. - **સંઘ સરકાર**

901. પ્રાણીઓ તરફની ક્રુરતાનું નિવારણ કઈ યાદીનો વિષય છે ? - **સમવર્તી યાદી**

902. નાણાં આયોગના સભ્યયોની નિમણૂક, રાષ્ટ્રપતિ અને સભ્યોની યોગતા નક્કી કરે છે ? - **સંસદ**

903. વિધાનપરિષદના કેટલા સભ્યો સ્થાનિક સત્તામંડળો દ્વારા ચૂંટાય છે ? - **1/3 સભ્યો**

904. ભારતીય બંધારણના ક્યા સુધારા અંતર્ગત શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સમાવવામાં આવ્યો ? - **86મો બંધારણ સુધારા અધિનિયમ**

905. કાયદા દ્વારા ....કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે. - **સંસદ**

906. એસ.આર.બોમાઈ કેસ સંકળાયેલ છે - **રાજ્યના સંબંધો**

907. નીતિ પંચમાં કઈ કાઉન્સિલ જોવા મળે ? - **ગવર્નિંગ કાઉન્સિલ અને રીજીયોનલ કાઉન્સિલ**

908. અનુચ્છેદ-37માં શું દર્શાવેલ છે ? - **રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું અમલીકરણ**

909. ભારત અને રાજ્ય સરકાર સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવે છે ? - **21 એપ્રિલ**

910. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની કામગીરી માટે મતદાર યાદી બનાવવી, ચૂંટણી કાર્યશાહી કરવી, જરૂરી દેખરેખ અને નિયંત્રણનું કાર્ય કરે છે ? - **ભારતનું ચૂંટણી પંચ**

911. ક્યો હક્ક એટલે કે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારો ભંગ ? - **સમાનતાનો હક**

912. બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજના અધિકારને બંધારણના આત્મા સમાન કહ્યો છે કારણ કે ..... - **જેના ભંગ બદલ સીધા જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકાય છે**

913. જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી........ નિભાવે છે. - **નાયબ અધ્યક્ષ**

914. રાષ્ટ્રગીત વંદે માતરમની રચના બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે મૂળ કઈ ભાષામાં કરી હતી ? - **બંગાળી**

915. કોઈપણ કાયદાના અર્થઘટનમાં કે અર્થઘટનમાં બંધારણનો ક્યો ભાગ માર્ગદર્શન આપે છે ? - **આમુખ**

916. ક્યા વ્યક્તિને ભારતના રાજ્યક્ષેત્રમાના તમામ ન્યાયાલયમાં સુનાવણીનો હક રહેશે ? - **એટર્ની જનરલ**

917. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 312 અન્વયે રાજ્યસભાને ....નું ગઠન કરવાની ભલામણ કરવાનો વિશિષ્ટાધિકાર છે. - **નવી અખિલ ભારતીય સેવાઓ**

918. વસતી નિયંત્રણ અને કુટુંબ નિયોજન કઈ યાદીનો વિષય છે ? - **સમવર્તી યાદી**

919. હાલમાં નીતિ આયોગમાં કેટલી વિંગ કાર્યરત્ છે ? - 3

920. રાજ્ય દ્વારા સુશાસન અંગેના કાયદા ઘડતી વખતે ધ્યાને લેવામાં આવે છે. - **રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત**

921. રાજ્ય નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જોવાનું કાર્ય કોનું છે ? - **રાજ્યપાલ**

922. કોણે ભારતીય સંઘને 'કેન્દ્રીકરણનું વલણ ધરાવતા સંઘ' તરીકે ગણાવ્યું ? - **આઈવર જેનીંગ્સ**

923. ક્યા હકમાં સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન લાગુ પડે છે ? - **સમાનતાનો હક**

924. સંઘ સેવા આયોગના સભ્યના હોદ્દાની મુદત કેટલી હોય છે ? - **હોદ્દો સંભાળે ત્યારથી 6 વર્ષની મુદત અથવા 65 વર્ષની ઉંમરમાંથી જે વહેલું બને તે**

925. ઉચ્ચતમ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? - **સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અપાત્રતાને કારણે**

926. લોકસભા દ્વારા રજૂ કરવામાં આવતા અનિચ્છનિય કાયદા ઉપર ફેરતપાસણીનું કાર્ય ક્યું ગૃહ કરે છે ? - **રાજ્યસભા**

927. ખેતીની જમીન સિવાયની મિલકતનું હસ્તાંતરણ બંધારણની કઈ યાદીમાં ઉલ્લેખિત છે ? - **સમવર્તી યાદી**

928. નીતિ આયોગ કઈ બાબતોમાં સલાહ આપશે ? - **ગુડ ગવર્નન્સ અને વધુ સારું વહીવટ તંત્ર**

929. વિધાન પરિષદવાળા રાજ્યમાં વિધાન પરિષદના કેટલા સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે ? - **1/3 સભ્યો**

930. લોકસભાના અધ્યક્ષ- ગૃહ દ્વારા **તેના પોતાના સભ્યોમાંથી ચૂંટાય છે.**

931. માન.ગવર્નરની લઘુત્તમ વય મર્યાદા કેટલી નક્કી કરાઈ છે ? - **35 વર્ષ**

932. ક્યા હક હેઠળ સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં ? - **સમાનતાનો હક**

933. બંધારણના ક્યા અનુચ્છેદમાં પોષણની કક્ષા અને જીવનધોરણ ઉંચા લાવવાની જોગવાઈ છે ? - **અનુચ્છેદ-47**

934. ક્ષેત્રાધિકાર ઉપરાંત અમલી બનશે એવી ભૂમિકા માત્રથી સંસદે ઘડેલો કોઈ કાયદો અમાન્ય બનશે નહીં, આવી જોગવાઈ વૈધાનિક સંબંધો અને વૈધાનિક સત્તાઓની વહેંચણીને લગતી છે તે ભારતીય સંવિધાનના ક્યા અનુચ્છેદ અન્વયે છે ? - **અનુચ્છેદ-245(2)**

935. કાયદા દ્વારા ....કોઈ પણ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે છે. - **સંસદ**

936. કોણ ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા ? - **જ્યોતિ બસુ, પશ્ચિમ બંગાળ**

937. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (CAG)નો પગાર કોણ નિયત કરે છે ? - **સંસદના કાયદાથી નિયત થાય છે**

938. **એટર્ની જનરલ ભારત સરકાર વિરુદ્ધ કેસ ? - લડી શકતા નથી**

939. સંસદ ગૃહમાં બિનપક્ષીય ધોરણે એટલે કે સ્વતંત્ર રીતે ચૂંટાયેલા સભ્ય પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તે ગૃહના સભ્ય માટે લાયક રહેશે ? - **ના**

940. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ ક્યારે અપનાવેલ ? - **22 જુલાઈ, 1947**

941. રાજ્યપાલ સામે મહાભિયોગ અંગેની શી જોગવાઈ છે ?- **રાજ્યપાલ સામે મહાભિયોગની જોગવાઈ નથી**

942. ભારતના સંવિધાનની મૂળ સંરચના શું હતી ? - **395 અનુચ્છેદ અને 22 ભાગ**

943. નાણાકીય સમિતિનો પ્રકાર જણાવો. - **અંદાજ સમિતિ**

944. ગુજરાતનો જાહેર મિલકતો અનધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારો ગોચર પરનું દબાણ હટાવવા ઉપયોગી થાય, આ વિધાન ? - **સાચું છે.**

945. પ્રસૂતિ સહાયતા માટે રાજ્ય જોગવાઈ કરશે તે અનુચ્છેદ ક્યો છે ? - **અનુચ્છેદ-42**

946. કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ? - **મુખ્ય ચૂંટણી કમિશનર**

947. કઈ બાબત દ્વારા કોલેજિયમ સિસ્ટમનું સ્થાન લેવાનો પ્રયત્ન થયો હતો ? - **નેશનલ જ્યુડિશિયલ અપોઈન્ટમેન્ટ કમિશન (NJAC)**

948. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની રચના ક્યારે થયેલ ? - **ફેબ્રુઆરી, 1964**

949. ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી..........માં આવેલ પદ્ધતિ આધારિત છે. - **ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ- 1935**

950. બંધારણની ભાવના સ્વતંત્ર ચળવળના ખ્યાલો તથા લોકોની અપેક્ષાઓનો શેમાં સમાવેશ થાય છે ? - **આમુખ**

951. એટર્ની જનરલ કોની મંજૂરી વિના કોઈ કંપની કે પરિષદના સલાહકારી પદ ધારણ કરી શકતા નથી ? - **ભારત સરકારની**

952. આમુખને નામદાર કોર્ટ દ્વારા ? - **અમલી બનાવી શકાતું નથી**

953. વિધાન પરિષદના કેટલા સભ્યો તેની કુલસંખ્ય સંખ્યાના સ્નાતક મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે ? - **1/2 સભ્યો**

954. સંવિધાન મુજબ દેશના શાસન માટે નીચેના પૈકી મૂળભૂત શું છે? - **રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો**

955. ભારવાહક ઢોરની કતલ પર પ્રતિબંધ મુકવા રાજ્ય પગલા ભરશે એટલે ક્યો અનુચ્છેદ ? - **અનુચ્છેદ-48**

956. બંધારણનું હાર્દરૂપ તત્વ ક્યું છે ? - **આમુખ**

957. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને કઈ રીતે સ્થાપેલ છે ? - **ખાસ કાયદા દ્વારા**

958. કોલેજિયમ સિસ્ટમમાં ન્યાયાધીશોની નિમણૂક અને બદલીની ભલામણ કોણ કરે છે ? - **સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય વરિષ્ઠ ચાર ન્યાયાધીશો**

959. કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા ?- **જે.બી.કૃપલાણી**

960. કેન્દ્રીય માહિતી કમિશનરશ્રીની નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં કોણ હોય છે ? - **વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાને નિયુક્ત કરેલા મંત્રી**

961. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં મહત્તમ કેટલા કમિશનરોની નિમણૂક કરી શકાય છે ? - **2**

962. રાજ્ય નાણાપંચની દર પાંચ વર્ષે...............દ્વારા થાય છે. - **સંબંધીત રાજ્યના રાજ્યપાલ**

963. આમુખની મૂળભૂત બાબતોમાં ? - **ફેરફાર શક્ય નથી**

964. જમીન મહેસૂલ ધારો ગૌચર પરનું દબાણ હટાવવા ઉપયોગી થાય, આ વિધાન ? - **સત્ય છે.**

965. સમાનતાના અધિકારમાં........ન્યાયના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે ? - **કુદરતી**

966. સંસદની જાહેર હિસાબી સમિતિના વડા તરીકે લોકસભાના વિરોધ પક્ષના સભ્ય હોવાનું કારણ.........છે. - **એક પરંપરા**

967. વિધાન પરિષદના કેટલા સભ્યો શિક્ષક મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે ? - **1/2 સભ્યો**

968. તપાસ સમિતિઓનો પ્રકાર જણાવો. - **વિશેષાધિકારો માટેની સમિતિ**

969. રાજ્યનીતિનો આ માર્ગદર્શક સિદ્ધાંતએ નાગરિકની મૂળભૂત ફરજ પણ છે ? - **પર્યાવરણનું રક્ષણ અને સુધારણા, જંગલ તેમજ વન્ય જીવોની સલામતીનું રક્ષણ**

970. ભારતીય બંધારણમાં સંઘ રાજ્યોના સંબંધોનો સ્રોત ક્યો છે ? - **કેનેડા**

971. નાણાપંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે છે એ અનુદાનને...............કહે છે. - **વૈધાનિક અનુદાન**

972. ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં અનુસૂચિત જનજાતિના સભ્યો માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે ? - **નગરપાલિકાના વિસ્તારમાં તે જાતિની વસતીની ટકાવારી જેટલી**

973. વ્યક્તિગત સ્વતંત્રતામાં.......અધિકારનો સમાવેશ થાય છે. - **જીવન જીવવાના**

974. 71મા બંધારણીય સુધારા અધિનિયમના હેતુ અને તર્ક જણાવો. - **સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ, બંધારણીય દરજ્જાની જોગવાઈ, સ્થાનિક શહેરી સરકારનું વધુ સારું શાસન**

975. જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહોમાં ચૂંટાય તો તેણે 10 દિવસમાં પોતે ક્યા ગૃહમાં રહેવા માગે છે તેની જાણ કરવી પડશે. જો તે આવું ના કરે તો કઈ બેઠક ખાલી રહેશે ? - **રાજ્યસભાની**

976. કાયદા દ્વારા ....કોઈપણ રાજ્યની સીમા બદલી શકે છે. - **સંસદ**

977. તાબાની અદાલતોને પોતાની હુકમતની બહાર જતી રોકવા કઈ રિટ ઉપયોગી છે ? - **પ્રતિષેધ આજ્ઞાપત્ર**

978. ભારતનું ચૂંટણીપંચ ક્યા વર્ષ સુધી એક જ વ્યક્તિનું બનેલું હતું ? - **ઓક્ટોબર, 1989**

979. ક્યા અનુચ્છેદમાં ગૌહત્યા પ્રતિબંધની જોગવાઈ છે ? - **અનુચ્છેદ-48**

980. બંધારણની કઈ બાબત સરકારની પદ્ધતિનો નિર્દેશ કરે છે ? - **આમુખ**

981. રાષ્ટ્રપતિને કાયદા વિષયક બાબતોમાં સલાહ આપવાની જવાબદારી કોની રહેશે ? - **એટર્ની જનરલ**

982. જ્યારે ખરડો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે ત્યારે તે કેટલી બહુમતીથી પસાર કરવો પડે ? - **હાજર અને મતદાન કરનાર સભ્યોની સાદી બહુમતીથી**

983. ક્યો આયોગ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતો હતો? - **ધાર આયોગ**

984. ચકાસણી અને નિયંત્રણ સમિતિઓનો પ્રકાર જણાવો. - **અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ**

985. લોકાયુક્ત આયોગમાં એ ફરિયાદમાં પૂછપરછ કરી શકે નહીં જે ફરિયાદનો સમયગાળો ? - **ફરિયાદનું કારણ ઊભું થયેલી 5 વર્ષથી વધુ હોય**

986. અનુચ્છેદ-16(4) હેઠળ રાજ્ય જાહેર રોજગારીની બાબતમાં ખાસ અનામતની જોગવાઈ ક્યા વર્ગ માટે કરી શકાય ? - **અન્ય પછાત વર્ગના નાગરિકો માટે**

987. ભારતીય સંવિધાનના ક્યા અનુચ્છેદમાં શાસન (ગવર્નન્સ) શબ્દનો ઉલ્લેખ છે ? - **અનુચ્છેદ-37**

988. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલા અહેવાલ રજૂ થાય તે જોવાનું કાર્ય કોનું છે ? - **રાજ્યપાલ**

989. લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013 ભારત દ્વારા સમર્થન આપવામાં આવેલી કઈ સંધિ હેઠળ ઘડવામાં આવ્યો છે ? - **યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓફ અગેઈન્સ્ટ કરપ્શન**

990. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો સ્રોત ક્યો છે ? - **અમેરિકા**

991. અનુચ્છેદ-23(1) હેઠળ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે ? - **મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરાવતી મજૂરી પર પ્રતિબંધ**

992. ગવર્નર (રાજ્યપાલ)ની નિમણૂક માત્ર ભારતના નાગરિકને જ આપી શકાશે, આ વાક્ય ? - **સાચુ છે**

993. જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? - **વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.**

994. રાજ્યપાલને કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને થયેલી શિક્ષા માફ કરવાની, અમલ મોકૂફ રાખવાની, તેમાં મહેતલ આપવાની કે તેમાંથી મુક્તિ આપવાની કે હળવી કરવાની સત્તા ક્યા અનુચ્છેદની જોગવાઈ હેઠળ છે ? - **અનુચ્છેદ-161**

995. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા નિમણૂક પામે છે ? - **1/6 સભ્યો**

996. ક્યા બંધારણીય સુધારાથી કેન્દ્રીય કાયદાની સંવેધાનિક કાયદેસરતા અંગેના પ્રશ્નો સંબંધમાં હકૂમત માત્ર ઉચ્ચત્તમ ન્યાયાલયની રહેશે તેવી જોગવાઈ છે ? - **42મો બંધારણીય સુધારો**

997. કોર્ટ ઓફ રેકર્ડ તરીકે કઈ કોર્ટને ઓળખાય છે ? - **સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ**

998. કઈ જ્ઞાતિઓ, જાતિઓને અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓ તરીકે જાહેર કરવી તે બંધારણીય અધિકાર કોનો છે? - **રાષ્ટ્રપતિનો**

999. કોના દ્વારા વહીવટી ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી છે ? - **ભારતનું સંવિધાન**

1000. ભારતીય સંસદીય પદ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું ? - **એવું વિધેયક, કે જે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ હોય.**

1001. રાષ્ટ્રપતિને જણાય કે કાયદાનો કે હકીકતનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો કે થવાનો સંભવ છે તેવા જાહેર મહત્ત્વના પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય મેળવવો ઈષ્ટ છે તો ક્યા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ તે પ્રશ્નને સુપ્રીમ કોર્ટને મોકલી શકે? - **અનુચ્છેદ-143**

1002. ભારતીય વિત્ત આયોગ ક્યા અનુચ્છેદ સાથે સંબંધિત છે ? - **અનુચ્છેદ-280**

1003. ભારતમાં અમુક ચોક્કસ વર્ગને અનામતના લાભો આપતા કાયદા છે. આવા કાયદાઓ ? - **બંધારણીય માન્યતા ધરાવે છે.**

1004. રાષ્ટ્રપતિને ધારાકીય સત્તા મળેલી છે ? - **અનુચ્છેદ-123**

1005. રાજ્યના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજ્યપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-200**

1006. ક્યા અનુચ્છેદ હેઠળ સમગ્ર દેશ માટે એક સરખો દીવાની ધારો ઘડવાની જોગવાઈ છે ? - **અનુચ્છેદ-44**

1007. કઈ બાબત રાજ્ય વહીવટ મૂળભૂત છે ? - **રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો**

1008. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં દર્શાવાયેલી છે ? - **અનુચ્છેદ-148**

1009. કાયદા ઘડતી વખતે કઈ બાબત લાગુ પાડવાની રાજ્યની ફરજ બની રહેશે ? - **રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો**

1010. જો કોઈ ગૃહનો ચાલુ સભ્ય બીજા ગૃહમાં ચૂંટાય તો તેની ક્યા ગૃહની બેઠક ખાલી પડશે ? - **પ્રથમ ગૃહની**

1011. રાજ્ય જાહેર સેવા આયોગનો વાર્ષિક અહેવાલ કોની સમક્ષ રજૂ કરાવાનો રહેશે ? - **રાજ્યપાલ**

1012. ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના અને રચના સાથે અનુચ્છેદ જોડાયેલો છે. - **અનુચ્છેદ-124**

1013. રાજ્યો અંતર્ગતની નદીઓના પાણીને લગતા વિવાદના ચુકાદા ક્યા અનુચ્છેદ અંતર્ગત આવે છે ? - **અનુચ્છેદ-262**

1014. સંસદના બંને ગૃહોની બેઠક ચાલુ ન હોય ત્યારે અને રાષ્ટ્રપતિને તાત્કાલિક પગલું ભરવાની જરૂરિયાત વિશે જણાય તો.......... જાહેર કરી શકે. - **વટહુકમ**

1015. ભારતીય બંધારણમાં રાજ્ય નીતિ નિર્દેશ સિદ્ધાંતોનો સ્રોત ક્યો છે ? - **આયર્લેન્ડ**

1016. રાષ્ટ્રપતિની આ વટહુકમો જાહેર કરવાની સત્તા જે બાબતો પરત્વે.... કાયદા ઘડી શકે છે તે બાબતો સુધી જ વિસ્તરે છે. - **સંસદ**

1017. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારણા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ તેવી જોગવાઈ અનુચ્છેદ-48(A)માં ક્યા બંધારણીય સુધારાથી કરવામાં આવી ? - **42મા**

1018. ક્યા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલના કાર્યો બજાવવા માટે પોતાને યોગ્ય લાગે તેવી જોગવાઈ કરી શકે છે ? - **અનુચ્છેદ-160**

1019. અસ્પૃશ્યતા નાબૂદીના સંબંધમાં સંવિધાનમાં કઈ જોગવાઈ છે? **- અસ્પૃશ્યતા આચરણની મનાઈ અને અસ્પૃશ્યતામાંથી ઉદ્‌ભવતી કોઈ નિર્યોગ્યતા લાગુ પાડવી તે શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવેલો છે.**

1020. ભારતના રાષ્ટ્રપતિએ કારોબારી તંત્રીય સત્તાનો ઉપયોગ બંધારણ અનુસાર કરવાનો છે અને રાષ્ટ્રપતિની સશસ્ત્ર દળોના સર્વોપરી આધિપત્યની સત્તાઓનો ઉપયોગ કાયદા દ્વારા નિયમન કરવાનો છે તેવી જોગવાઈ **- અનુચ્છેદ-53**

1021. જો કોઈ વ્યક્તિ સંસદના એક કોઈ એક ગૃહમાં બે બેઠકો પરથી ચૂંટાય તો ? **- કોઈ એક બેઠક માટે વિકલ્પ આપવો પડશે અન્યથા બન્ને બેઠકો ખાલી પડશે.**

1022. મૂળભૂત હકોમાં સુધારો **- કરી શકાતો નથી**

1023. અખિલ ભારતીય સેવાઓના સભ્ય વિરુદ્ધ રાજ્યના મુખ્યમંત્રી કઈ કાર્યવાહી કરી શકે ? **- મુલ્કી કર્મચારીને ફરજ મોકુફી**

1024. રાજ્ય દ્વારા ....ક્ષેત્રમાં ખિતાબ આપી શકાય છે. **- લશ્કરી અથવા શૈક્ષણિક**

1025. ગોચર પરનું દબાણ દૂર કરવા ફોજદારી કાર્યવાહી ધારો ઉપયોગી થાય, આ વિધાન ? **- સાચું છે.**

1026. કોણ મફત કાનૂની સેવાઓ માટે પાત્ર છે ? **- સ્ત્રીઓ અને બાળકો, કેદમાં રહેલા વ્યક્તિઓ, દિવ્યાંગ વ્યક્તિઓ, સરેરાશ આવક ચોક્કસ મર્યાદાની નીચે હોય.**

1027. શીખ ધર્મની માન્યતામાં કીરપાણ ધારણ કરવું અને તે સાથે લઈને ફરવું તેવું સ્પષ્ટીકરણ બંધારણના **ક્યા અનુચ્છેદમાં છે ?** - અનુચ્છેદ-25

1028. મત્સ્ય ક્ષેત્રો કઈ યાદીનો વિષય છે ? **- રાજ્ય યાદી**

1029. બંધારણના મૂળભૂત હેતુઓને વાચા કોણ **આપે છે ? - આમુખ**

1030. ....રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ સંખ્યામાં બેઠકો અનામત છે ? **- મધ્ય પ્રદેશ**

1031. રાજ્યમાં રાજ્યપાલના અવસાન કે રાજીનામા**થી રાજ્યપાલની** ફરજો કોણ બજાવે છે ? - **હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ**

1032. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં તેની નિમણૂક પછી કોઈ ......થાય તેવો ફેરફાર કરી શકાશે નહીં ? **- ગેરલાભ**

1033. ટેલિકોમ્યુનિકેશન પદ્ધતિઓમાં કામે રાખેલી' વ્યક્તિઓ બાબતમાં ... મૂળભૂત હકો નિયંત્રિત કરી શકે છે કે ઘટાડી શકે છે. **- સંસદ**

1034. રાજ્યપાલને ક્યા અનુચ્છેદ હેઠળ વટહુકમની સત્તા પ્રાપ્ત થયેલ છે ? **- અનુચ્છેદ-213**

1035. ભારતના કોઈ નાગરિકથી કોઈ....... પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાશે નહીં. **- વિદેશી રાજ્ય**

1036. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતા અંગેની જોગવાઈ ભારતના બંધારનો ક્યો અનુચ્છેદ ? **- અનુચ્છેદ-6**

1037. ......જેનો વહીવટ કરે છે તેવી ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઈ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે ? **- રાજ્ય**

1038. ભારતનો કોઈ નાગરિક કોની સંમતિથી વિદેશી રાજ્યો પાસેથી ખિતાબ સ્વીકારી શકે ? **- રાષ્ટ્રપતિ**

1039. ભારતીય બંધારણમાં સરકારના મંત્રીમંડળનું સ્વરૂપનો સ્રોત ક્યો છે ? **- બ્રિટન**

1040. રાજ્ય જાહેર સેવા આયોગે.........ની સલાહ ન સ્વીકારી હોય તો તેના કારણો સમજાવતી યાદી સહિત અહેવાલ વિધાનમંડળ સમક્ષ મુકાવાશે ? **- રાજ્યપાલ**

1041. મિલકતનો અધિકાર ક્યા અનુચ્છેદ સાથે જોડાયેલો છે ? **- અનુચ્છેદ-300-A**

1042. ક્યા અધિનિયમ અન્વયે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, રાજ્ય માનવ અધિકાર આયોગ, માનવ અધિકાર ન્યાયાલયોનું સંગઠન કરાય છે ? **- માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993**

1043. રીટ ઓફ મેન્ડેમસ ક્યારે દાખલ કરવામાં આવે છે ? **- નામદાર ન્યાયાલય દ્વારા તાબાની કોર્ટ, અધિકારીને ન્યાયપૂર્ણ ફરજ બજાવવા માટે આદેશ કરવા**

1044. વ્યાપાર સલાહકાર સમિતિ ક્યા પ્રકારની સમિતિ ગણાય ? **- સંસદીય સમિતિ**

1045. મૂળભૂત હકો........રૂપથી માન્ય છે. **- કાનૂની**

1046. લઘુમતી સમુદાયના વિકાસનું મૂલ્યાંકન કોણ કરે છે ? **- રાષ્ટ્રીય લઘુમતી પંચ**

1047. બંધારણની છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત આવતા ક્ષેત્રોના વહીવટમાં વિશેષતા જણાવો. **- કેટલીક બાબતોમાં કાયદો બનાવવાની, જનજાતિઓની આંતરિક બાબત ઉકેલવા, શાહ-કારો પર નિયંત્રણ રાખવા**

1048. પ્રદૂષણમુક્ત હવા, કાનૂની સહાય, **શિક્ષણ મેળવવું** વગેરે ભારતીય બંધારણમાં શું છે ? **- મૂળભૂત અધિકાર**

1049. CAGના અહેવાલોની ચકાસણી કઈ સમિતિ કરે છે ? **- જાહેર હિસાબ સમિતિ**

1050. મૂળભૂત હકોને લાગુ પાડવા અલગ કાયદાની જરૂર નથી, વિધાન **- સત્ય છે**

1051. એટર્ની જનરલને સંસદના બંને ગૃહમાં બોલવાનો અને તેની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે, આ વિધાન **- સત્ય છે**

1052. ભારતીય સંવિધાનના અનુચ્છેદ-7-a અનુસાર કેન્દ્રની સંસદ ....ની બનેલી છે. **- રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા**

1053. સુપ્રીમ કોર્ટને કોઈપણ અરજીની ખાસ પરવાનગી મંજૂર કરવાની જે હકુમત છે તેના સંદર્ભમાં આ સત્તા ગણાય ? **- વિવેકાધીન**

1054. રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાનની ભલામણ કોણ કરે છે? **- રાજ્ય નાણાં પંચ**

1055. ગ્રામીણ વિકાસ રાજ્ય સંસ્થાનો ઉદ્દેશ શું છે ? **- પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની યોજનાનો વ્યાપ વધારવો અને અમલીકરણ કરવું**

1056. મૂળભૂત હકો વ્યક્તિગત કલ્યાણને પ્રોત્સાહન આપે છે આથી આ જોગવાઈ કેવી ગણી શકાય ? **- વ્યક્તિગત**

1057. જાહેર સેવા આયોગ ક્યા અનુચ્છેદ સાથે સંબંધિત છે ? **- અનુચ્છેદ-315**

1058. યોગ્ય જોડકા જોગો. **- સમાનતાનો હક-અનુચ્છેદ-14-18, શોષણ વિરુદ્ધનો** હક-અનુચ્છેદ-23-24, **બંધારણીય ઉપાયનો** હક-અનુચ્છેદ-32-33, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક-અનુચ્છેદ-25-28

1059. અદાલતોને ટ્રિબ્યુનલો (ન્યાય પંચો) ગણાય. - **જિલ્લા ગ્રાહક મંચ, કૌટુંબિક અદાલતો, શ્રમ અદાલતો**

1060. પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા લેવાની ભલામણ થાય છે. - **રાજ્ય નાણા પંચ**

1061. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ક્યા પ્રકારની ગણાય ? - **સંસદીય સમિતિ**

1062. બંધારણ દ્વારા લઘુમતીના રક્ષણ માટેની જોગવાઈના અમલીકરણ પર દેખરેખ રાખવાનું કાર્ય કોણ કરે છે ? - **રાષ્ટ્રીય લઘુમતી પંચ**

1063. સર્ટીઓરરી રિટ એટલે શું ? - **નીચલી કોર્ટનું બાકી રહેતા કેસનું દફતર ઉચ્ચ અદાલત નિકાલ માટે મેળવી શકે છે.**

1064. ભારત કે રાજ્ય સરકાર મુલકી હેસિયતથી નોકરી કરતી વ્યક્તિને ઈજાઓ અંગેનું પેન્શન મેળવવાના દાવા વિશે લોક સેવા આયોગની સલાહ લેવાવી જોઈએ તેવી જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-320**

1065. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરશે ? - **અનુચ્છેદ-51**

1066. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારામાં અનુસૂચિત જાતિઓ એટલે ? - **બંધારણની કલમ 366ના ખંડ 24 મુજબની જાતિઓ**

1067. ભારત સરકારના નાણાકીય હિસાબોનું ફોર્મેટ કોના દ્વારા નિર્ધારિત થાય છે ? -**કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)**

1068. અસ્પૃશ્યતાની પ્રથા એક સજાપાત્ર ગુનો છે જે ક્યા ભારતીય અનુચ્છેદમાં તેની નાબૂદીનો સમાવેશ છે ? - **અનુચ્છેદ-17**

1069. ખોટા નામ-સરનામાવાળા વોટર્સ આઈડી કાર્ડને મતદાર યાદીમાંથી દૂર કરવા શરૂ કરાયેલા NERPAPનું પૂરું નામ આપો. - **નેશનલ ઈલેક્ટ્રોરલ રોલ પ્યુરિફિકેશન એન્ડ ઓથેન્ટિકેશન પ્રોગ્રામ**

1070. રાજ્યનીતિના સિદ્ધાંતો .... છે. - **માર્ગદર્શન**

1071. ચૂંટણી પંચનો VVPAT પ્રોજેક્ટ શાના સાથે સંબંધિત છે ? - **મત આપનારને તેનો મત અપાઈ ગયો છે તેની એક રિસિપ્ટ અપાય છે.**

1072. ક્યા પંચની ભલામણથી વર્ષ 1935માં ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી ? - **હિલ્ટન યંગ પંચ**

1073. એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ? - **રાષ્ટ્રપતિ**

1074. સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ-21ને જીવનના અધિકારને વ્યાપક રૂપે .... તરીકે અર્થઘટન કર્યું છે. - **ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર**

1075. લઘુમતી સમુદાયના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે સંશોધન અભ્યાસ કોણ હાથ ધરે છે ? - **રાષ્ટ્રીય લઘુમતી પંચ**

1076. ....નો અમલ કરવાની જોગવાઈ ભારતીય બંધારણમાં નથી ? - **રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો**

1077. અનુસૂચિત જાતિ કે જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા મુજબ ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાતની પ્રેક્ટિસ જરૂરી છે ? -**7 વર્ષ**

1078. ....ગૃહ નાણાં વિધેયકનો સ્વીકાર કે સુધારો કરવાની સત્તા ધરાવતું નથી. - **રાજ્યસભા**

1079. રાજ્ય દ્વારા લાદવામાં આવેલ વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણીની ભલામણો કોણ કરે છે ? - **રાજ્ય નાણાં પંચ**

1080. બળવંતરાય મહેતા સમિતિ અનુસાર જિલ્લા કલેક્ટર - **જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ.**

1081. અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-338-ક**

1082. સંસદમાં પ્રતિનિધિઓની સહમતિથી પસંદગી પામેલા હંગામી સ્પીકરને શું કહેવાય છે ? - **પ્રોટેમ સ્પીકર**

1083. લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીત્તેર) વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-334**

1084. ફાસ્ટટ્રેક કોર્ટ, લોક અદાલતનો ભારતીય બંધારણમાં ઉલ્લેખ નથી, આ વિધાન ? - **સાચું છે.**

1085. કઈ જાતિઓ કે આદિજાતિઓના ક્યા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણાવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-341**

1086. ભારતીય બંધારણના અનુચ્છેદ 19 મુજબ પ્રેસની સ્વતંત્રતા સંદર્ભે..... - **સ્પષ્ટ ઉલ્લેખ નથી.**

1087. ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? - **રાષ્ટ્રપતિ**

1088. લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-330**

1089. ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદ્દા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? - **આર્ટિકલ-124(4)**

1090. અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? - **સંસદ**

1091. કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના ક્યા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-342**

1092. 'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઈપણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈપણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-17**

1093. જ્યારે એક ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલો ખરડો બીજા ગૃહ દ્વારા નામંજુર કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ શું કરે ? - **સંયુક્ત બેઠક બોલાવે**

1094. નાણાં વિધેયક રાજ્યના ક્યા ગૃહમાં રજૂ કરવામાં આવતું નથી? - **વિધાન પરિષદમાં**

1095. અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? - **આર્ટિકલ-244**

1096. અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-338**

1097. ભારતમાં નિયંત્રક મહાલેખા પરિક્ષકને કોની જેમ અને જે કારણે હોદ્દા પરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે દૂર કરી શકાશે ? - **ઉચ્ચત્તમ ન્યાયાલયના ન્યાયાધીશને**

1098. ભારતીય બંધારણના અનુચ્છેદ-19 મુજબ પ્રેસની સ્વતંત્રતા સંદર્ભે.... - **તેમાં વાણી અને અભિવ્યક્તિની સામાન્ય સ્વતંત્રતામાં પ્રવાહિત છે.**

1099. ભારતીય બંધારણના ક્યા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેની ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? - **16**

1100. પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-340**

1101. વજન અને માપના ધોરણો સ્થાપવા તે કઈ યાદીનો વિષય છે? - **સંઘ યાદી**

1102. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વિરુદ્ધ અત્યાચારના ગુનાઓને રોકવા માટે અત્યાચાર નિવારણ અધિનિયમની રચના સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી ? - **1989**

1103. ધન વિધેયક વિધાનસભામાં પસાર થયા પછી તેને ક્યા પ્રસારિત કરાય છે ? - **વિધાન પરિષદ**

1104. ભારતના કોઈપણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-275**

1105. ભારતીય સંવિધાનમાં 'અસ્પૃશ્યતા'ની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. ભારતીય સંવિધાનમાં આ જોગવાઈ ક્યા ધારાના આધારે કરવામાં આવી છે ? - **નાગરિક હક રક્ષણ ધારો-1955**

1106. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? - **આર્ટિકલ-46**

1107. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. - **હરિલાલ કણિયા**

1108. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમની કોઈ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-15(A)**

1109. લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ....થી વધુ ન હોવી જોઈએ. - **20**

1110. સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણમાં ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-335**

1111. નગરપાલિકાઓના અધ્યક્ષના હોદ્દા, રાજ્ય વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તેવી રીતે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને સ્ત્રીઓ માટે અનામત રાખવા જોઈશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-243-બ (4)**

1112. ભારતીય બંધારણના અનુચ્છેદ-19 મુજબ પ્રેસની સ્વતંત્રતા સંદર્ભે.... - **તેમાં લેખન અને પ્રકાશનની સ્વતંત્રતા સામેલ છે.**

1113. અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-339**

1114. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-46**

1115. ભારતીય બંધારણમાં જંગલો કઈ યાદીમાં સમાવિષ્ટ છે ? - **સમવર્તી યાદી**

1116. ભારતીય બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા અનુક્રમે ...... અન્વયે રિટ આપવામાં આવી છે. - **અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226**

1117. અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ બંધારણની કઈ અનુસૂચિમાં છે ? - **પાંચમી**

1118. 73માં બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામુ કોણ બહાર પાડી શકે ? - **રાષ્ટ્રપતિ**

1119. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? - **એન.ગોપાલાસ્વામી આયંગર**

1120. ભારતીય બંધારણમાં જાહેર આરોગ્ય કઈ યાદીમાં સમાવિષ્ટ છે ? - **રાજ્ય યાદી**

1121. બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? - **22 જુલાઈ, 1947**

1122. ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? - **આર્ટિકલ-5**

1123. ક્યા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટે કાયદાની કાયદેસર પ્રક્રિયા તરીકેની પ્રસ્થાપિત પ્રક્રિયાને ફરીથી વર્ણવી છે ? - **અનુચ્છેદ-21**

1124. સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? - **એટર્ની જનરલ**

1125. ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? - **પરિશિષ્ટ-VII**

1126. સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. - **સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે.**

1127. બંધારણના કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? - **કલમ-155**

1128. ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? - **ડૉ.રાજેન્દ્ર પ્રસાદ**

1129. મૂળભૂત અધિકારના આધારે રાજ્યની નીતિના સિદ્ધાંતોનું નિર્દેશન કરવાની અગ્રતા સાથે ક્યો બંધારણીય સુધારો જોડાયેલો છે ? - **42મો**

1130. હાઈકોર્ટના ન્યાયાધીશની બદલી કોણ કરે છે ? - **રાષ્ટ્રપતિ**

1131. પૂર્વ મંજૂરી સિવાય સદસ્ય કેટલા દિવસ વિધાનસભાની બેઠકમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થયેલું ગણાય છે ? - **60**

1132. ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? - **નાગરિક અધિકાર**

1133. ભારતીય ઈતિહાસ સંદર્ભે પ્રાંતોમાંથી બંધારણીય સભાના સભ્યો..... - **પ્રાંતીય વિધાનસભા દ્વારા ચૂંટાયેલા**

1134. ભારતના બંધારણમાં સંયુક્ત યાદીનો ખ્યાલ ....થી. લેવાયો છે. - **ઓસ્ટ્રેલિયા**

1135. પ્રેસની સ્વતંત્રતા બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-19 (એ)**

1136. 86મા બંધારણીય સુધારાથી ક્યો નવો અનુચ્છેદ બંધારણમાં ઉમેરાયો ? - **અનુચ્છેદ-21 (એ)**

1137. સિક્કિમ ક્યા વર્ષથી ભારતનું રાજ્ય બન્યું ? - **1975**

1138. અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે? - **ત્રણ વાર**

1139. ભારતીય બંધારણમાં ટપાલ ખાતાની બચત બેંક કઈ યાદીમાં સમાવિષ્ટ છે ? - **કેન્દ્ર યાદી**

1140. કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? - **અનુચ્છેદ-14**

1141. ધન વિધેયક સંદર્ભે વિધાનસભા ગૃહ જો વિધાન પરિષદના કોઈ સૂચનો ન સ્વીકારે તો નાણાં વિધેયક ? - **પસાર કરવામાં આવી ગયું છે એમ મનાશે.**

1142. અંતરિક્ષ વિભાગ અને પરમાણુ ઊર્જા વિભાગ ભારત સરકારના ક્યા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? - **કોઈપણ મંત્રાલય હેઠળ આવતા નથી.**

1143. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ? - **લક્ષ્મીમલ સિંઘવી**

1144. લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે અનામતની સૌથી મોટી સંખ્યામાં બેઠકો ધરાવતું રાજ્ય - **મધ્ય પ્રદેશ**

1145. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર એ ભારતમાં...... છે. - **વૈધાનિક અધિકાર**

1146. ભારતીય બંધારણની કલમ 3 અનુસાર સંસદની સત્તા સંદર્ભે શું સાચું છે ? - **રાજ્ય વિધાનસભા અસંમત હોય તો પણ સંસદ પ્રવર્તમાન રાજ્યમાંથી નવા રાજ્ય બનાવી શકે છે.**

1147. વિકાસ નિગમ, રાજ્યના અવિકસિત પ્રદેશોમાં વિકાસ સાધવા માટે સ્થાપવામાં આવે છે. આ વિકાસ નિગમની અધ્યક્ષતા માટે કોણ અધિકૃત છે ? - **રાજ્યપાલ**

1148. જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ...... નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. - **સંસદ**

1149. સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયંત્રક પદ્ધતિ છે. ક્યું સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી. - **બદનક્ષી**

1150. સહકારી મંડળીમાં નિર્દેશકોને પસંદ કરવા માટેના લાયક મતદારો ક્યા છે ? - **સહકારી મંડળીના સભ્યો**

1151. ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? - **24 જાન્યુઆરી, 1950**

1152. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? - **રાષ્ટ્રપતિ**

1153. ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો ક્યા વર્ષથી અમલમાં મૂકાયો ? - **1989**

1154. 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? - **આર્ટિકલ-153**

1155. લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-330**

1156. બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે.? - **45**

1157. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક ક્યા અનુચ્છેદ કરે છે ? - **અનુચ્છેદ-340**

1158. સામાન્ય વિધેયક સંદર્ભે સંસદના બંને ગૃહોની ..... સત્તા છે. - **સમાન**

1159. જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? - **સર્વોચ્ચ અદાલત**

1160. ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સત્તા કોને છે ? - **સર્વોચ્ચ અદાલતને**

1161. બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? - **જજ સમક્ષ વ્યક્તિને રજૂ કરવાનું કાર્ય**

1162. અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? - **નાણાં ખાતું**

1163. જિલ્લાની અદાલતોમાં દિવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે તેને શું કહેવામાં આવે છે ? - **જિલ્લા ન્યાયાધીશ**

1164. મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યા રાજ્યમાં આવેલી છે ? - **આસામ**

1165. મૂળભૂત ફરજોના ભંગ બદલ ? - **કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી.**

1166. બંધારણમાં લોકહિતકારી રાજ્યની વિભાવનાનો સમાવેશ કરે છે... - **રાજ્ય નીતિ નિર્દેશ સિદ્ધાંતો**

1167. રાજ્ય છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઈ કરશે તે પ્રકારની જોગવાઈ ભારતના સંવિધાનમાં મૂળભૂત હકમાં ક્યા વર્ષમાં કરવામાં આવેલ છે ? - **ઈ.સ.2010**

1168. ભારતના સંવિધાનમાં 'મૂળભૂત ફરજો'નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે? - **1976**

1169. સંઘને એક લોકસેવા આયોગ રહેશે આ જોગવાઈ સંવિધાનના ક્યા આર્ટિકલમાં છે ? - **અનુચ્છેદ-315**

1170. ભારતીય બંધારણમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? - **ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા**

1171. કઈ બાબતોમાં ગૃહમાં રજૂ કરતા પૂર્વે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી બને છે ? - **રાજ્યનું હિત હોય તેવા કરોને અસરકર્તા બાબતો, નાણાકીય વિષયોના સંબંધમાં, રાજ્યની સીમાઓમાં ફેરફાર**

1172. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ અથવા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને અનુચ્છેદ-18 તથા 29 (2)ના કોઈ મજકૂરથી બાધ આવશે નહી તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા સુધારાથી કરવામાં આવેલ છે ? - **પ્રથમ**

1173. લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? - **આઠ**

1174. મીનરવા મીલ્સ વિરૂદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે' ? - **બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.**

1175. પંજાબને વિભાજિત કરી પંજાબ અને હરિયાણા નામના બે રાજ્યો ક્યા વર્ષમાં બનાવવામાં આવ્યા ? - **ઈ.સ.1966**

1176. ભારત સ્વતંત્ર થયા બાદ અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોના એકીકરણ થવાથી રાજ્યોનું ચાર વર્ગોમાં વિભાજન થયેલ તેમાં (અ) વર્ગના રાજ્યોમાં કુલ કેટલા રાજ્યો હતા ? - **9**

1177. ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકુફ રાખવાની સત્તા કોને છે ? - **સ્પીકર અને ચેરમેન**

1178. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ 'Fundamental Duties' ક્યા દેશના બંધારણમાંથી પ્રેરણા મેળવીને લેવામાં આવેલ છે ? - **યુ.એસ.એસ.આર. (અગાઉનું સોવિયેટ યુનિયન)**

1179. જો લોકસભામાં સ્પીકર અને ડે.સ્પીકરનું સ્થાન રિક્ત હોય તો તેવા સંજોગોમાં સ્પીકરની ફરજ કોણ બજાવશે ? - **ગૃહના એવા સભ્ય જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે**

1180. રાજ્યમાં વિધાન પરિષદ દૂર કરવા અથવા તેનું સર્જન કરવા માટે કોણ ભલામણ કરી શકે ? - **રાજ્યની વિધાનસભા**

1181. 1976માં અસ્પૃશ્યતા (નિવારણ) અધિનિયમનું નામ બદલીને...... થયું. - **નાગરિક હક્કોનું સંરક્ષણ અધિનિયમ**

1182. બંધારણમાં મૂળભૂત અધિકારોની પૂર્તિ કરે છે.... - **રાજ્ય નીતિ નિર્દેશ સિદ્ધાંતો**

1183. ભારતના બંધારણ હેઠળ ક્યો માનવહક્ક તેમજ મૂળભૂત હક્ક છે ? - **શિક્ષણનો હક્ક**

1184. ભારતના બંધારણના ક્યા સુધારાને 'પુનઃ સ્થાપન સુધારો' કહી શકાય ? - **44મો સુધારો**

1185. ગૃહમાં ક્યારે સ્પીકર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે? - **મત સરખા પડે તેવા કિસ્સામાં**

1186. ક્યા રાજ્યમાં રાજ્યપાલે બંધારણીય ફરજિયાત રીતે આદિવાસી બાબતોના મંત્રીની નિમણૂક કરવી પડે છે ? - **મધ્ય પ્રદેશ**

1187. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ અદાલતમાં રિટ દાખલ કરી શકાય ? - **જે તે રાજ્યની વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત**

1188. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધા આવે તે રીતે ધાર્મિક આસ્થા સ્થાપવાનો અને નિભાવવાનો અધિકાર ? - **અનુચ્છેદ-26**

1189. રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો રાજીનામું કોને સુપ્રત કરી શકે છે ? - **ઉપરાષ્ટ્રપતિને**

1190. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુતમ ઉંમર કેટલી છે ? - **પાંત્રીસ વર્ષ**

1191. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે ? - **રાષ્ટ્રપતિ**

1192. રાજ્યસભામાં કેટલા સભ્યોનું નામાંકન રાષ્ટ્રપતિ કરી શકે છે? - **બાર**

1193. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોના હિસાબોનું ઓડિટ કરી શકે નહી ? - **ખાનગી કંપનીઓ**

1194. જો સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય તો કોની હાજરીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ લેશે ? - **સર્વોચ્ચ ન્યાયાલયના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ**

1195. 'અમે ભારતના લોકો' આ વાક્યથી શરૂ થતી ભારતના બંધારણની પ્રસ્તાવના જવાહરલાલ નેહરુ દ્વારા ક્યારે પાસ કરવામાં આવી ? - **13 ડિસેમ્બર, 1946**

1196. 'યહ સંવિધાન જીન આદર્શો પર આધારિત હૈ ઉનકા ભારત કી આત્મા સે કોઈ સંબંધ નહીં હૈ... યહ સંવિધાન યહાં કી પરિસ્થિતિયો મેં કાર્ય નહીં કર પાયેગા' બંધારણ સભાના ક્યા સભ્યનો આ મત છે ? - **લક્ષ્મીનારાયણ સાહૂ**

1197. ભારતીય બંધારણ સભાના પ્રથમ સભાપતિ કોણ હતા ? - **સચ્ચિદાનંદ સિન્હા**

1198. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ કઈ બાબત સાથે સંબંધિત છે ? - **સંસદ બંધારણમાના કોઈપણ મૂળભૂત અધિકારને ઘટાડી શકતી નથી.**

1199. ભારતીય બંધારણમાં ભાષાઓનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં આવે છે ? - **આઠમી અનુસૂચિમાં**

1200. ભારતીય બંધારણમાં મૂળ ફરજોની પ્રેરણા ક્યા રાષ્ટ્રના બંધારણ પાસેથી લેવામાં આવી છે ? - **રશિયા**

1201. ભારતીય બંધારણમાં માન્યભાષા તરીકે કેટલી ભાષાઓનો નિર્દેશ છે ? - **22**

1202. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે ? - **એક હસ્તાંતરણપાત્ર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ**

1203. ભારતીય બંધારણમાં પરિવર્તન કોણ કરી શકે ? - **સંસદ**

1204. ડૉ. આંબેડકરે ક્યા અધિકારને 'બંધારણનું હૃદય અને આત્માનું' નામ આપ્યું હતું ? - **બંધારણીય ઉપાયોનો અધિકાર**

1205. ભારતના પહેલા રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કોના દ્વારા થઈ હતી ? - **બંધારણ સભા દ્વારા**

1206. ભારતનું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું ? - **26 જાન્યુઆરી, 1950**

1207. બંધારણના આરંભ પહેલા અમલમાં હોય તે તમામ કાયદા મૂળભૂત હકોની જોગવાઈઓ સાથે અસંગત હોય તે પૂરતા રદ બાતલ ગણાશે આ જોગવાઈ ? - **અનુચ્છેદ-13**

1208. ભારતીય સંવિધાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કાયદા ઘડવા માટે યાદી આપવામાં આવી છે, આવી કેટલી યાદી છે ? - **ત્રણ**

1209. રાષ્ટ્રપતિ વર્ષના ક્યા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? - **પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં)**

1210. બંધારણ રચનાર સમિતિ સમક્ષ બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું ? - **જવાહરલાલ નેહરુ**

1211. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ માટે ? - **રાજ્ય સત્તાને કાયદાની રૂએ પડકારી શકાય નહીં**

1212. કોઈ ન્યાયાલયથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈનો અમલ કરાવી શકાશે નહી આ બાબત ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-37**

1213. નીતિ આયોગ (NITI આયોગ)માં NITI શું દર્શાવે છે ? - **National Institution For Transforming India**

1214. ભારતીય બંધારણમાં 'આમુખ' સમાવિષ્ટ થયેલ છે. તે ક્યા દેશના બંધારણના આધારે ? - **અમેરિકા**

1215. ભારતના 'દરેક નાગરિકને રાજ્યક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો અધિકાર' બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ? - **અનુચ્છેદ-19 (1)(ઘ)**

1216. ભારતીય બંધારણના ભાગ-4માં શું સમાવિષ્ટ છે ? - **રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો**

1217. અતારાંકિત પ્રશ્નો સમયે.... - **પુરક પ્રશ્નો પૂછી શકાય નહીં.**

1218. સંસદના સભ્યપદ માટેની ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ રાજ્યસભાની બેઠક માટે ઉંમરની લાયકાત કેટલી છે ? - **ઓછામાં ઓછી ત્રીસ વર્ષ**

1219. ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિની સત્તાઓમાં કઈ સત્તા 'ન્યાયતંત્રની સત્તા' છે ? - **ગુનેગારને માફી આપવાની સત્તા**

1220. ભારતના કોઈપણ રાજ્યમાં બહુમતીપક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરવાની સત્તા કોની ? - **રાજ્યના રાજ્યપાલની**

1221. જિલ્લાની અદાલતો સંદર્ભે સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય ? - **ફોજદારી મુકદમા ચલાવે તે ન્યાયાધીશને**

1222. 'નીતિ આયોગ' ભારતમાં ક્યારથી અમલમાં આવ્યું ? - **જાન્યુઆરી 2015થી**

1223. દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની જોગવાઈ બંધારણના ક્યા આર્ટિકલમાં છે ? - **અનુચ્છેદ-51 A**

1224. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ક્યા અનુચ્છેદ અંતર્ગત પંચાયતની સ્થાપનાનો ઉલ્લેખ છે ? - **અનુચ્છેદ-40**

1225. હાલ ગુજરાતમાં નાણા આયોગના ચેરમેન કોણ છે ? - **ડૉ.ભરત ગરીવાલા**

1226. ભારતમાં ક્યા વર્ષથી ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત વધુ બે કમિશનરોની નિમણૂક કરવાનું શરૂ કર્યું ? - **16 ઓક્ટોબર, 1989**

1227. રાજ્ય સેવા આયોગના ચેરમેન અને સભ્યોની હોદ્દો ભોગવવા માટેની મહત્તમ મુદત કેટલા વર્ષની ? - **છ વર્ષ**

1228. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક અંગેની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-148**

1229. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ સમિતિની ભલામણને આધારે કરે છે તે સમિતિના સભ્યો.... - **વડાપ્રધાન, ગૃહમંત્રી અને વિરોધપક્ષના નેતા**

1230. બંધારણીય સુધારા વિધેયક મામલે સંસદના બંને ગૃહોની .... સત્તા છે. - **સમાન**

1231. માહિતી અધિકાર અધિનિયમ વિશ્વમાં સૌપ્રથમ ક્યા દેશે અમલમાં મૂક્યો ? - **સ્વીડન**

1232. સત્યમેવ જયતે ક્યા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે ? - **મૂંડકોપનિષદ**

1233. ભારતના બંધારણનું આમુખ બંધારણનો ભાગ જ ગણાય તેમ ક્યા ચુકાદાથી ઠરાવવામાં આવ્યું છે ? - **કેશવાનંદ ભારતી વિ. કેરાલા રાજ્ય**

1234. ભારતના બંધારણમાં આમુખમાં 'અખંડતા' શબ્દ ક્યા વર્ષમાં ઉમેરવામાં આવ્યો હતો ? - **1976**

1235. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર ક્યા આધારે નિયંત્રણ મૂકી શકાય છે ? - **શિષ્ટતા અને નીતિમત્તા**

1236. બંધારણના ક્યા ભાગમાં ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવા માટે પ્રયત્ન કરશે તેવી જોગવાઈ છે ? - **ભાગ-IV**

1237. બંધારણના આર્ટિકલ 15(1) નાગરિકો પ્રત્યે કઈ કઈ બાબતે ભેદભાવ આચરવા પર પ્રતિબંધ મૂકે છે ? - **ધર્મ, જાતિ, જ્ઞાતિ અને સ્થળ**

1238. ભારતના બંધારણના આમુખ અનુસાર 'સાર્વભૌમત્વ' કોના સંદર્ભમાં પ્રયોજવામાં આવેલ છે ? - **ભારતના લોકો**

1239. બંધારણ સભાએ બંધારણને કઈ તારીખે આત્માર્પિત કરેલ હતું? - **26 નવેમ્બર, 1949**

1240. રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે.? - **અનુચ્છેદ-364**

1241. બંધારણના આમુખમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવ સુનિશ્ચિત કરવાની ખાતરી કોના માટે છે ? - **ભારતના નાગરિકો માટે**

1242. ભારતના બંધારણે ક્યા પ્રકારના ખિતાબો એનાયત કરવાની છૂટ આપી છે ? - **શૈક્ષણિક વિશિષ્ટતા સૂચક**

1243. નીચલી અદાલતે કરેલા નિર્ણય કે આદેશને રદ કરવા માટે કઈ રિટ કાઢવામાં આવે છે ? - **ઉત્પ્રેષણની રિટ**

1244. બંધારણના આર્ટિકલ 15(5)માં ક્યા વર્ષમાં કેટલામાં સુધારાથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકો માટે અને અનુ. જાતિ, જનજાતિ માટે શિક્ષણ સંસ્થામાં જગ્યા અનામત રાખવાની જોગવાઈ કરી છે ? - **2005માં 93મો સુધારો**

1245. રાજયપાલને રાષ્ટ્રપતિ પોતાના સહીસિક્કાવાળા ....થી નિમશે. - **આદેશપત્ર**

1246. બંધારણના કેટલામાં સુધારાથી મતાધિકાર માટેની વય 21થી ઘટાડી 18 વર્ષની કરવામાં આવી છે ? - **61મો સુધારો**

1247. સંઘ યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદીના વિષયો બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? - **પરિશિષ્ટ-7**

1248. બંધારણના આર્ટિકલ 24થી ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને ક્યા પ્રકારના કામમાં રોકવા પર પ્રતિબંધ છે ? - **કારખાનામાં, ખાણમાં અને જોખમી કામમાં**

1249. બંધારણના આર્ટિકલ 25ની સ્પષ્ટીકરણ નોંધ 1 મુજબ શીખ ધર્મની માન્યતામાં શું ધારણ કરવાનો સમાવેશ થાય છે ? - **કિરપાણ**

1250. અંતઃકરણ અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારના સ્વાતંત્ર્ય પર ક્યા આધારે નિયંત્રણ મૂકી શકાય છે ? - **નીતિમત્તા અને સ્વાસ્થ્ય**

1251. ક્યો અનુચ્છેદ રાષ્ટ્રના મહત્વના સ્મારકો, સ્થળો અને પદાર્થોના રક્ષણ માટે રાજ્યને જવાબદાર ગણે છે ? - **અનુચ્છેદ-49**

1252. ક્યા સુધારાથી મિલકતનો અધિકાર હવે મૂળભૂત હક રહ્યો નથી ? - 44મા સુધારા

1253. સામાન્ય રીતે જેના મૂળભૂત હકનો ભંગ થયો હોય તેણે જ રિટ કરવી જોઈએ તે સિદ્ધાંતનો અપવાદ કઈ રિટ છે ? - **બંદી પ્રત્યક્ષીકરણ**

1254. બંધારણના આર્ટિકલ 22 અનુસાર ધરપકડ કરાયેલી વ્યક્તિને કેટલા કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ ? - **24 કલાક**

1255. ક્યા બંધારણ સુધારાથી શિક્ષણને મૂળભૂત હકનો દરજ્જો પ્રદાન કરેલ છે ? - **86માં સુધારાથી**

1256. 6થી 14 વર્ષની વયજૂથના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની બંધારણીય ફરજ કોના પર લાદવામાં આવી છે ? - **રાજ્ય પર**

1257. બંધારણના આર્ટિકલ-55માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજ્યની વસતી ધ્યાનમાં લેવાની જોગવાઈ છે તે વસતી એટલે ક્યા વર્ષની વસતી ગણવાની છે ? - **1971**

1258. મૂળભૂત કર્તવ્યોને ....પદ્ધતિઓ દ્વારા પ્રવર્તન કરી શકાય છે. - **બંધારણીય**

1259. 'બેસ્ટ બેકરી કેસ' તરીકે જાણીતો થયેલો ચૂકાદો ક્યો ? - **ઝહિરા શેખ વિ. સ્ટેટ ઓફ ગુજરાત**

1260. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી લડવા માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? - **35 વર્ષ**

1261. ભારતના મુખ્ય ન્યાયામૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-126**

1262. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્નેની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ બજાવે છે ? - **સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધિશ**

1263. બંધારણ સમીક્ષા સમિતિ વર્ષ 2000માં રચવામાં આવી હતી તેના અધ્યક્ષ કોણ હતા ? - **ન્યાયમૂર્તિ એમ.એન.વેંકટ ચેલૈયાહ**

1264. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કોણ કરે છે ? - **રાજ્ય સરકાર**

1265. તારાંકિત પ્રશ્નો સમયે ..... - **પુરક પ્રશ્નો પૂછી શકાય છે.**

1266. કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણીય સુધારો ક્યારે થયો ? - **1956**

1267. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજસુધીમાં નાણાકીય કટોકટીની ઉદઘોષણા કેટલી વખત કરવામાં આવેલ છે ? - **એકેય વખત નહીં**

1268. ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્‌ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ? - **અનુચ્છેદ-19**

1269. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળ મળેલી છે ? - **અનુચ્છેદ-123**

1270. વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની પાસે છે ? - **રાષ્ટ્રપતિ**

1271. મૂળભૂત કર્તવ્યો ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા..... - **લાગુ કરી શકાતા નથી.**

1272. ન્યાયનો હેતુ સિદ્ધ કરવા માટે ઉચ્ચતમ ન્યાયાલયને લાગે તો તે કોઈપણ ઉચ્ચ ન્યાયાલયમાં નિકાલ બાકી હોય તેવો કોઈ કેસ, અપીલ બીજા કોઈ ઉચ્ચ ન્યાયાલયને ભારતના સંવિધાનના ક્યા અનુચ્છેદની જોગવાઈ હેઠળ તબદીલ કરી શકે છે ? - **અનુચ્છેદ-139-ક (2)**

1273. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? - **અનુચ્છેદ-36થી 51**

1274. સંઘ લોક સેવા આયોગના સભ્યપદેથી નિવૃત્ત થયા બાદ ફરીથી તે જ જગ્યા પર સભ્ય તરીકે પુનઃ નિમણૂક આપી શકાતી નથી તેવી જોગવાઈ ભારતના સંવિધાનના ક્યા અનુચ્છેદમાં થયેલી છે ? - **અનુચ્છેદ-319**

1275. લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસતીના પ્રમાણમાં બેઠકો વર્ષ 2020 સુધી અનામત રાખવાની જોગવાઈ ક્યા બંધારણીય સુધારાથી અમલમાં છે ? - **95મા**

1276. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ....ના આધારે વિવિધ મર્યાદાઓને આધિન છે. - **રાજ્યની સુરક્ષા, જાહેર વ્યવસ્થા, બદનક્ષી, ન્યાયાલયની અવજ્ઞા**

1277. ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? - **લોકસભા અને રાજ્યસભાના સભ્યો**

1278. ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા કરવામાં આવી હતી ? - **મદ્રાસ**

1279. કમ્પ્ટ્રોલર ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક .... દ્વારા કરવામાં આવે છે. - **રાષ્ટ્રપતિ**

1280. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? - **લક્ષ્મીમલ સિંઘવી**

1281. 'મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં' આ ઉક્તિ કોની ? - **ગાંધીજી**

1282. ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ)ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? - **લોર્ડ માઉન્ટ બેટન**

1283. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી .... મતદાર દ્વારા થાય છે. - **નિર્વાચિત**

1284. બંધારણ સભામાં ક્યા દિવસે 'જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? - **24 જાન્યુઆરી, 1950**

1285. ભારતમાં સત્તાવાર કેટલી ભાષા છે ? - **22**

1286. ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો હક કોને છે? : **સંસદ**

1287. ભારતીય ન્યાયતંત્ર પાસે કાયદાને ગેરબંધારણીય કાયદો જાહેર કરવાની સત્તા છે જ્યારે....- **કાયદો બંધારણીય કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોય.**

1288. 74મા બંધારણ સુધારા અનુસાર ક્યા વિસ્તારમાં પાલિકાની રચના થતી નથી ? : **ઔદ્યોગિક ટાઉનશિપ**

1289. એકમાત્ર કિસ્સો કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાની વીટોની સત્તાનો ઉપયોગ કર્યો હોય ? - **ધ ઈન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ**

1290. ભારતના બંધારણના ભાગ-4કમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કોના માટે છે ? - **ભારતના દરેક નાગરિક માટે**

1291. ભારતીય બંધારણનો અનુચ્છેદ-280 નાણાપંચની જોગવાઈ કરે છે. જે........ છે. - **અર્ધ ન્યાયિક સંસ્થા**

1292. બંધારણની કઈ બાબતમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય શબ્દનો સમાવેશ થાય છે ? - **આમુખ**

1293. નીતિ આયોગના નાયબ અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ? - **વડાપ્રધાન**

1294. ભારતના વિદેશી બાબતોના મંત્રીના સમકક્ષ યુ.એસ.એ.માં .... હોય છે. - **સેક્રેટરી ઓફ સ્ટેટ**

1295. ભારતીય બંધારણમાં સહવર્તી સૂચિનો સ્રોત ક્યો છે ? - **ઓસ્ટ્રેલિયા**

1296. નાગરિકને મફત કાનૂની સહાય રાજ્ય પૂરી પાડશે એટલે ક્યો અનુચ્છેદ ? - **અનુચ્છેદ-39-A**

1297. ધરપકડ અને અટકાયત સામે રક્ષણના અધિકારમાં તેની પસંદગીના ....ની સલાહ લેવાના તેમજ તેની મારફતે બચાવ કરવાનો અધિકાર સમાવિષ્ટ છે. - **ધારાશાસ્ત્રી**

1298. સંસદની રચના ક્યા અનુચ્છેદ હેઠળ થાય છે ? - **અનુચ્છેદ-79**

1299. રાષ્ટ્રપતિશ્રી..........ની ઘોષણા કરે ત્યારે મૂળભૂત હકો નિયંત્રિત કરતો હુકમ કરવામાં આવે છે ? - **કટોકટી**

1300. ધર્મ સ્વાતંત્ર્ય હકના સંબંધમાં રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ....શિક્ષણ આપવામાં આવતું નથી - **ધાર્મિક**

1301. નાણાં આયોગના સભ્યો તરીકે નિમવા માટેની આવશ્યક લાયકાતો અને તેમને પસંદ કરવાની રીતની સત્તા ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ કોને મળેલ છે ? - **સંસદને**

1302. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? - **પરિશિષ્ટ -2**

1303. લાભના પદો માટેની સંયુક્ત સમિતિ ક્યા પ્રકારની ગણાય ? - **સંસદીય સમિતિ**

1304. દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? - **આર્ટિકલ-332(1)**

1305. લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે ? - **હા અને ના માં મડાગાંઠ પડે ત્યારે**

1306. ક્યા ભંડોળમાંથી ખર્ચ કરવા માટે પ્રથમ સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે ? - **એકત્રિત ભંડોળ**

1307. ક્યો અનુચ્છેદ સંસદને પ્રવર્તમાન રાજ્યોની સરહદો બદલીને નવું રાજ્ય બનાવવા સમર્થ બનાવે છે ? - **અનુચ્છેદ-3**

પંચાયતી રાજ

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. 73મા બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?
   A) મહિલાઓ B) અનુસૂચિત જાતિઓ
   C) અનુસૂચિત જનજાતિઓ D) ઉપરોક્ત તમામ
2. ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
   A) વન વિકાસ સમિતિના પ્રમુખ
   B) સરપંચ
   C) તલાટી
   D) સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

3. જિલ્લાની વસ્તી 4 લાખ કરતા વધુ ન હોય તેવા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા........હોય છે.
   A) 15 B) 17 C) 18 D) 16
   (નોંધ : નવા સુધારા મુજબ 18 આવે)

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

4. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?
   A) સમવર્તી યાદી B) રાજ્ય યાદી
   C) રાષ્ટ્રપતિ યાદી D) કેન્દ્ર યાદી
5. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ?
   A) 15 અને 24 B) 7 અને 9 C) 7 અને 15 D) 5 અને 15
   (નોંધ : નવા સુધારા મુજબ 8 અને 16 આવે)
6. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?
   A) 90 દિવસ B) 45 દિવસ C) 30 દિવસ D) 60 દિવસ
7. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?
   A) ભૌગોલિક સ્થિતિ B) આર્થિક સ્થિતિ
   C) ઉદ્યોગોની સંખ્યા D) વસતિની સંખ્યા

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

8. ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો.
   A) ધીરૂભાઈ દેવરામ B) સુનિલ પટેલ
   C) સંજય પારગી D) મીયા હુસેન

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

9. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ?
   A) લોર્ડ લિયન B) લોર્ડ મેયો C) લોર્ડ કર્ઝન D) લોર્ડ રિપન
10. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?
   A) અનુસૂચિ-9 B) અનુસૂચિ-6
   C) અનુસૂચિ-11 D) અનુસૂચિ-12

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

11. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?
   A) વસતીની સંખ્યા B) વિસ્તારનું ક્ષેત્રફળ
   C) વિસ્તારમાં ઘરોની સંખ્યા D) વિસ્તારની આવક
12. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ?
   A) સરપંચ B) કમિશનર
   C) ટી.ડી.ઓ D) તલાટી કમ મંત્રી

GPSC પેપર - 1 - 2017

13. જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ?
   A) 73મા બંધારણીય સુધારા અધિનિયમ
   B) 74મા બંધારણીય સુધારા અધિનિયમ
   C) સી.એચ. હનુમંત રાવ સમિતિ
   D) દાંતેવાલા સમિતિ
14. "લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
   A) એલ.એમ. સિંઘવી B) એન.કે.પી. સાલ્વે
   C) કે.સી. પંત D) જી.વી.કે. રાવ

1)A, 2)B, 3)B, 4)B, 5)C, 6)D, 7)D, 8)C, 9)D, 10)C, 11)A, 12)D, 13)B, 14)A.

GPSC MAINS પેપર - 1 - 2016

15. પંચાયતના કરમાં 'લેન્ડ સેસ' શું છે ?
A) જમીન મહેસૂલ B) જમીન મહેસૂલ પરનો સરચાર્જ
C) ઘરવેરો D) ઉપર પૈકીનો કોઈ નહી

16. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?
A) એક તૃતીયાંશ B) એક પંચમાશ
C) પચાસ ટકા D) પાંત્રીસ ટકા

17. ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?
A) 21મી એપ્રિલ B) 24મી એપ્રિલ
C) 26મી એપ્રિલ D) 2જી એપ્રિલ

બિન સચિવાલય ક્લાર્ક - 2016

18. પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ?
A) રાજસ્થાન B) દિલ્હી C) તામિલનાડુ D) કર્ણાટક

19. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કયારથી થઈ ?
A) પ્રથમ નાણાંપંચથી
B) 73માં બંધારણ સુધારા બાદ
C) પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ
D) બંધારણના આરંભથી

20. ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કયારથી સોંપવામાં આવી.
A) 2004 B) 2007 C) 2006 D) 2005

21. સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
A) રિખવદાસ શાહ સમિતિ B) ઝીણાભાઈ દરજી સમિતિ
C) બળવંતરાય મહેતા સમિતિ D) અશોક મહેતા સમિતિ

22. ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી?
A) અશોક મહેતા સમિતિ B) બળવંતરાય મહેતા સમિતિ
C) ઝીણાભાઈ દરજી સમિતિ D) રિખવદાસ શાહ સમિતિ

GPSC પ્રિલિમ - 2001

23. બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ?
A) દેશી રાજ્યનું એકીકરણ B) ભાષાવાર પ્રાંત રચના
C) પંચાયતી રાજ D) ભારતનું બંધારણ

24. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?
A) શિક્ષણ સમિતિ B) આરોગ્ય સમિતિ
C) કલ્યાણ સમિતિ D) સામાજિક ન્યાય સમિતિ

GPSC પ્રિલિમ - 2007

25. પંચાયતની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ?
A) સાત વર્ષ B) કોઈ મુદત નથી
C) ચાર વર્ષ D) પાંચ વર્ષ

PSI ખાતાકીય - 23/04/2017

26. 73મા બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?
A) મહિલાઓ B) અનુસૂચિત જાતિઓ
C) અનુસૂચિત જનજાતિઓ D) ઉપરોક્ત તમામ

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

27. નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે?
A) જીલ્લા આયોજન મંડળ B) રાજ્ય ફાયનાન્સ કમિશન
C) રાજ્યના નાણામંત્રીશ્રી D) રાજ્યના પંચાયતમંત્રીશ્રી

GPSC Class - 2 - 29/1/2017

28. પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
A) 243 ચ B) 243 છ C) 243 જ D) 243 ઝ

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

29. સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે?
A) જિલ્લા પંચાયત પ્રમુખ B) સચિવ, પંચાયત વિભાગ
C) તલાટી D) જિલ્લા વિકાસ અધિકારી

30. નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે?
A) વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ B) રિખવદાસ શાહ સમિતિ
C) બબલભાઈ મહેતા સમિતિ D) ભૂરિયા સ સમિતિ

15)B, 16)C, 17)B, 18)A, 19)B, 20)C, 21)B, 22)B, 23)C, 24)D, 25)D, 26)A, 27)B, 28)D, 29)D, 30)B.

GPSC Class - 2 - 18/12/2016

31. રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?
A) 15 એપ્રિલ B) 20 એપ્રિલ C) 21 એપ્રિલ D) 24 એપ્રિલ

GPSC Class - 2 - 12/2/2017

32. પંચાયતમાં સભ્યપદમાં માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
A) 243 E (1) B) 243 F (1) C) 243 D (1) D) 243 C (1)

33. 'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે?
A) ગૌણ ખનીજ ઉત્ખન્ન B) ગૌણ વનપેદાશોની માલિકી
C) જમીન અને જમીન સંપાદન D) ઉપરોક્ત બધીજ બાબતો

GPSC Class - 2 - 28/1/2017

34. રાજયમાં પંચાયતી સંસ્થાઓની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા માટે ફાયનાન્સ કમિશન (Finance Commission) ની રચના કરવાની જવાબદારી કોની છે?
A) માન.મુખ્યમંત્રીશ્રી B) માન.નાણામંત્રીશ્રી
C) માન.ગવર્નરશ્રી D) માન.રાષ્ટ્રપતિશ્રી

GPSC Class-1 - 15/01/2017

35. ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે રાજય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલું છે?
A) અનુચ્છેદ - 39 B) અનુચ્છેદ - 39 A
C) અનુચ્છેદ - 40 D) અનુચ્છેદ - 41

36. ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બન્ને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે ?
A) તલાટી કમ મંત્રી B) તાલુકા વિકાસ અધિકારી
C) સરપંચ D) પ્રમુખ તાલુકા પંચાયત

37. ગુજરાત રાજ્યનાં પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયીક પ્રક્રિયા માટે .... ની વ્યવસ્થા છે.
A) ન્યાય પંચાયત B) સમાધાન પંચ
C) ન્યાયની સ્થાનિક અદાલત D) મામલતદાર કચેરી

38. ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ?
A) રાષ્ટ્રીય કક્ષાની સમિતિ B) રાજ્ય કક્ષાની સમિતિ
C) જિલ્લા પંચાયત D) સ્થાનિક પંચાયત

39. ગુજરાત રાજ્યની રચના (1લી મે, 1960) બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ .... થી શરૂ કરવામાં આવ્યો.
A) 1 લી જાન્યુઆરી, 1962 B) 1 લી એપ્રિલ, 1963
C) 1 લી ફેબ્રુઆરી, 1962 D) 1 લી માર્ચ, 1963

40. ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયીક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે?
A) ગામ કે નગર પંચાયત B) સ્થાનિક અદાલત
C) જિલ્લા અદાલત D) રાજ્યની વડી અદાલત

41. ગ્રામ પંચાયતે દર વર્ષના કયા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (બજેટ) તૈયાર કરી દેવાનું હોય છે ?
A) જાન્યુઆરી B) ફેબ્રુઆરી C) માર્ચ D) એપ્રિલ
(નોધ : 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાનું હોય છે)

42. પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?
A) હૃદયરોગના હુમલાથી B) રોડ અકસ્માત
C) વિમાની દુર્ઘટનાને કારણે D) આત્મઘાતી હુમલાથી

43. ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા ....
A) વધુ વિકસવા પામી B) બળવત્તર બનવા પામી
C) ગણતરીપૂર્વક નાશ પામી D) એકતાની ભાવના વિકસી

44. ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારે પંચાયતી રાજ્યના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષપદે કોની નિમણૂક કરી હતી ?
A) શ્રી ઝીણાભાઈ દરજી B) શ્રી જીવરાજ મહેતા
C) શ્રી હિતેન્દ્રભાઈ D) શ્રી બળવંતરાય મહેતા

45. લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ?
A) પંચાયતીરાજનો B) ગ્રામ સ્વરાજનો
C) હિન્દ સ્વરાજનો D) રાષ્ટ્ર સ્વરાજનો

46. 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે.' કોણ કહે છે?
A) શ્રી એસ.કે.ડે. B) અન્ના હજારે
C) મહાત્મા ગાંધીજી D) ઝીણાભાઈ દરજી

47. ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ?
A) તાલુકા પંચાયત B) જિલ્લા પંચાયત
C) ગ્રામ સભા D) ગ્રામ સેવક

48. તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી ....
A) પ્રત્યક્ષ રીતે થાય છે. B) પરોક્ષ રીતે થાય છે.
C) થતી નથી.
D) પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે.

49. ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે?
A) તાલુકા વિકાસ અધિકારી B) જિલ્લા વિકાસ અધિકારી
C) વિકાસ કમિશ્નર D) જિલ્લા પંચાયત પ્રમુખ

31)D, 32)B, 33)D, 34)C, 35)C, 36)C, 37)A, 38)C, 39)B, 40)A, 41)A, 42)C, 43)C, 44)A, 45)A, 46)A, 47)A, 48)B, 49)B.

50. બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ?
A) ગ્રામ પંચાયત, B) નગર પંચાયત
C) તાલુકા પંચાયત D) જિલ્લા પંચાયત

51. ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે ક્યા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યુ ?
A) 1952 B) 1954 C) 1956 D) 1958

52. પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે ?
A) પંચ ત્યાં પ્રગતિ B) પંચ ત્યાં પ્રેમ
C) પંચ ત્યાં પરમેશ્વર D) પંચ ત્યાં પરિવાર

53. જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતોની રચના કરવી જોઈએ ?
A) ત્રિસ્તરીય B) એક સ્તરીય
C) દ્વિ સ્તરીય
D) કોઈ પણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ

54. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ?
A) ચાર અઠવાડિયા B) 15 દિવસ
C) બે અઠવાડિયા D) એક અઠવાડિયું

55. ગ્રામ પંચાયતના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે ?
A) ચાર વર્ષ B) પાંચ વર્ષ C) ત્રણ વર્ષ D) છ વર્ષ

56. વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ?
A) ત્રણ B) બે C) એક D) ચાર

57. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે?
A) ગ્રામસભાના સભ્યો B) ગામના શિક્ષિત આગેવાનો
C) ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો D) ગ્રામસભા નક્કી કરે તે

58. પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?
A) ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
B) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
C) ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
D) મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

59. તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ?
A) પાંચ B) નવ C) સાત D) અગિયાર

60. ગ્રામ પંચાયતના સભાસદો એટલે ?
A) ગામના તમામ લોકો B) ગામની પુખ્તવયની વ્યક્તિ
C) ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો
D) ગ્રામ પંચાયતના સભ્યો

61. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો?
A) 1959 B) 1961 C) 1960 D) 1963

62. પંચાયતીરાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ?
A) રિખવદાસ શાહ સમિતિ B) ઝીણાભાઈ દરજી સમિતિ
C) અશોક મહેતા સમિતિ D) બળવંતરાય મહેતા સમિતિ

63. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ?
A) ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.
B) ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.
C) ઉમેદવારે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
D) ઉમેદવાર ધો. 12 પાસ હોવો જોઈએ.

64. તાલુકા પંચાયતનો વહિવટ ચલાવનાર અધિકારી ક્યા નામથી ઓળખાય છે ?
A) મામલતદાર B) ચીટનીશ
C) તાલુકા વિકાસ અધિકારી D) તાલુકા વહીવટી અધિકારી

65. આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ?
A) બળવંતરાય મહેતા B) જી.વી.કે. રાવ
C) રામસિંગ પુનિયા D) દિલીપસિંહ ભૂરિયા

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

66. ભૂરીયા સમિતિ કઈ બાબતો અંગેની છે ?
A) કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સબંધો
B) પછાતવર્ગોની ઓળખ કરવી
C) અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ
D) બંધારણની કામગીરીની સમીક્ષા

GPSC Class - 2 - 16/04/2017

67. પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના ક્યા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે?
A) 243 - E B) 243 - F C) 243 - G D) 243 - H

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

68. દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કુલ સંખ્યાના .... ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ, અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે.
A) એક ચતુર્થાંશ B) એક પંચમાંશથી
C) એક તૃતીયાંશથી D) ઉપર પૈકી એકપણ નહીં

50)B, 51)D, 52)C, 53)C, 54)A, 55)B, 56)B, 57)C, 58)A, 59)B, 60)C, 61)D, 62)B, 63)A, 64)C, 65)D, 66)C, 67)C, 68)C.

GPSC આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) - 26/03/2017

69. પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત ક્યા આર્ટીકલમાં દર્શાવવામાં આપેલી છે ?
A) 243-D B) 243-E C) 243 F D) 243-G

GPSC Class - 2 - 18/03/2017

70. પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમા કરવામાં આવેલી છે?
A) 243 (D) B) 243 (C) C) 243 (B) D) 243 (A)

નાયબ ચિટનીશ - 02/06/2015

71. બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?
A) રૂા.50,000 B) રૂા.1,50,000
C) રૂા.75,000 D) રૂા.1,00,000

72. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
A) જિલ્લા પંચાયત પ્રમુખ B) જિલ્લાના પ્રભારી મંત્રી
C) કલેક્ટર D) જિલ્લા વિકાસ અધિકારી

73. જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ?
A) કારોબારી B) આરોગ્ય C) શિક્ષણ D) સામાજિક ન્યાય

74. રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે?
A) વિકાસ કમિશ્નર
B) જિલ્લા વિકાસ અધિકારી
C) પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
D) જિલ્લા પંચાયત પ્રમુખ

75. ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યા રાજયથી થઈ હતી ?
A) ગુજરાત B) મહારાષ્ટ્ર
C) રાજસ્થાન D) હિમાચલ પ્રદેશ

76. પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?
A) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
B) ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
C) ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
D) મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

77. તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યની બને છે ?
A) નવ B) પાંચ C) સાત D) અગિયાર

78. જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ ?
A) એક B) ત્રણ C) બે D) ચાર

79. ગ્રામસભાના સભાસદો એટલે ?
A) ગામના તમામ લોકો
B) ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો
C) ગામની પુખ્તવયની વ્યકિત
D) ગ્રામ પંચાયતના સભ્યો

80. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની છે ?
A) બે B) એક
C) ત્રણ D) જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી

81. ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે ?
A) મામલતદાર B) જિલ્લા જમીન દફતર નિરીક્ષક
C) તલાટી કમ મંત્રી D) તાલુકા વિકાસ અધિકારી

82. પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?
A) સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
B) ગામોનું નવનિર્માણ
C) ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી
D) (A), (B) અને (C) માં દર્શાવેલ તમામ

83. તાલુકા પંચાયતમાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ?
A) 11 B) 15 C) 13 D) 9
(નોંધ : નવા સુધારા મુજબ 16 આવે)

84. લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ?
A) પંચાયતોની બેઠકો B) ગ્રામ સભાઓ
C) પંચાયતની સમિતિની બેઠકો
D) (A), (B) અને (C) માં દર્શાવેલ તમામ

85. ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ?
A) મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો
B) સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા
C) વિધાનસભા અને સંસદસભા જેવો
D) (B) અને (C) માં દર્શાવ્યા જેવો

86. ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ?
A) તલાટી કમ મંત્રી B) ઉપસરપંચ
C) સરપંચ D) ગ્રામ પંચાયત

87. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ?
A) 15 નવેમ્બર B) 15 ડિસેમ્બર
C) 15 જાન્યુઆરી D) 31 માર્ચ

69)C, 70)A, 71)B, 72)B, 73)D, 74)A, 75)C, 76)B, 77)A, 78)B, 79)B, 80)D, 81)B, 82)D, 83)B, 84)D, 85)A, 86)C, 87)B.

88. ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?
A)સરપંચ B)તાલુકા વિકાસ અધિકારી
C)તલાટી કમ મંત્રી D)જિલ્લા વિકાસ અધિકારી

89. જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ?
A)સરપંચ B)પ્રાથમિક શાળાના આચાર્ય
C)તલાટી કમ મંત્રી D)ગ્રામ પંચાયત કલાર્ક

90. જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?
A)મહેસૂલી આવકના 75 ટકા B)મહેસૂલી આવકના 5 ટકા
C)મહેસૂલી આવકના 3.5 ટકા D)મહેસૂલી આવકના 7.5 ટકા

91. ગ્રામ પંચાયતના દફતરો કોના હવાલે રાખવામાં આવે છે ?
A)સરપંચ B)ગ્રામ પંચાયત કલાર્ક
C)ગ્રામ પંચાયત મંત્રી
D)નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહીવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે

92. ગ્રામ પંચાયત ક્યો વેરો લાદી શકતી નથી ?
A)મકાન વેરો B)જકાત વેરો
C)ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ
D)ગટર વેરો

93. જિલ્લા પંચાયતો ક્યા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?
A)મુંબઈ વિલેજ એક્ટ, 1920
B)ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
C)વિલેજ એક્ટ, 1963
D)ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

94. નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં ક્યો હોદ્દો છે ?
A)મદદનીશ તાલુકા વિકાસ અધિકારી
B)મદદનીશ સચિવ
C)નાયબ તાલુકા વિકાસ અધિકારી
D)મદદનીશ તાલુકા પંચાયત મંત્રી

95. તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે ?
A)તાલુકા મામલતદાર B)તાલુકા પંચાયત પ્રમુખ
C)તાલુકા વિકાસ અધિકારી D)કારોબારી સમિતિના અધ્યક્ષ

96. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?
A)એક B)બે
C)ત્રણ D)સભ્યોની સંખ્યા જેટલા

97. ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?
A)મતદારો સીધા મત આપી ચૂંટે છે
B)તાલુકા વિકાસ અધિકારી
C)ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
D)જિલ્લા વિકાસ અધિકારી

98. છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?
A)જિલ્લા પંચાયત B)નગર પંચાયત
C)તાલુકા પંચાયત D)ગ્રામ પંચાયત

99. બ્રિટીશ રાજ્યના ક્યા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે ?
A)લોર્ડ મેયો B)લોર્ડ માઉન્ટ બેટન
C)લોર્ડ રીપન D)લોર્ડ વેલેસ્લી

100. ગ્રામ પંચાયતના સરપંચ ક્યા રાજ્યમાં 'ચેરપર્સન' તરીકે ઓળખાય છે ?
A)સિક્કિમ B)કર્ણાટક
C)અરૂણાચલ પ્રદેશ D)કેરલ

101. મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે ?
A)15000 B)3000 C)10000 D)5000
(નોંધ : નવા સુધારા મુજબ 25,000 આવે)

102. ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?
A)7 થી 12 B)5 થી 12
C)વોર્ડની સંખ્યા જેટલી D)7 થી 15
(નોંધ : નવા સુધારા મુજબ 8 થી 24 આવે)

103. ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?
A)રાજ્ય ચૂંટણી આયોગ B)વિકાસ કમિશ્નર
C)કલેક્ટર D)જિલ્લા વિકાસ અધિકારી

104. ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?
A)21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
B)તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
C)ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
D)(A), (B) અને (C) માં દર્શાવેલ તમામ

105. પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?
A)તાલુકા પંચાયત B)ગ્રામ પંચાયત
C)જિલ્લા પંચાયત
D)(A), (B) અને (C) માં દર્શાવેલ તમામ

106. પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?
A)ભારતનું ચૂંટણી આયોગ B)વિકાસ કમિશ્નર
C)રાજ્ય ચૂંટણી આયોગ D)કલેક્ટર

107. ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ?
A)સરપંચ B)તલાટી કમ મંત્રી
C)ઉપસરપંચ
D)(A), (B) અને (C) માં દર્શાવેલ તમામ સાથે મળીને

108. ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે?
A)એક B)ત્રણ C)બે D)ચાર

109. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?
A)તાલુકા વિકાસ અધિકારી B)જિલ્લા વિકાસ અધિકારી
C)તાલુકા પંચાયતના પ્રમુખ D)પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી

88)A, 89)C, 90)D, 91)C, 92)B, 93)D, 94)A, 95)C, 96)B, 97)A, 98)B, 99)C, 100)C, 101)A, 102)D, 103)C, 104)D, 105)B, 106)C, 107)A, 108)D, 109)B.

110. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે?
A) પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
B) સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી
C) સમિતિઓની રચના
D) (A), (B) અને (C) માં દર્શાવેલ તમામ

111. જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ?
A) જિલ્લા પંચાયતના પ્રમુખ
B) જિલ્લા વિકાસ અધિકારી
C) જિલ્લા પંચાયતની સામાન્ય સભા
D) કારોબારી સમિતિ

112. તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?
A) તાલુકા પંચાયતના પ્રમુખ B) વિકાસ કમિશ્નર
C) જિલ્લા પંચાયતના પ્રમુખ D) જિલ્લા વિકાસ અધિકારી

113. જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?
A) કલેક્ટર B) વિકાસ કમિશ્નર
C) પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
D) રાજ્ય ચૂંટણી આયોગ

114. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ?
A) તાલુકા પંચાયતના પ્રમુખ
B) જિલ્લા વિકાસ અધિકારી
C) નાયબ જિલ્લા વિકાસ અધિકારી
D) તાલુકા વિકાસ અધિકારી

નાયબ ચિટનીશ - 05/02/2017

115. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ?
A) 2 (17) B) 2 (16) C) 2 (15) D) 2 (18)

116. ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો ક્યા નિયમમાં જણાવેલ છે ?
A) 6 B) 7 C) 8 D) 9

117. ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ (Article)માં આપવામાં આવેલી છે ?
A) 243 (b) B) 243 (e) C) 243 (d) D) 243 (a)

118. ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ?
A) 7 B) 8 C) 9 D) 6

119. 'જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ)
A) 60 B) 61 C) 62 D) 59

120. ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ?
A) 243 H B) 243 G C) 243 F D) 243 E

121. પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગ (Finance Commission) ની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં છે ?
A) 243 (2) B) 243 I (3) C) 243 I (4) D) 243 I (1)

122. નાણાપંચની ગ્રાન્ટમાંથી ક્યા કામો લઈ શકાતા નથી ?
A) હાટ બજાર B) આંતરિક રસ્તા
C) સોલાર લાઈટ D) સ્ટ્રીટ લાઈટ

123. પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ (Artical)માં છે ?
A) 243 (B) (2) B) 243 F (1)
C) 243 (H) (a) D) 243 E (1)

124. ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ-જામીન ખતનું ફોર્મ ક્યા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ?
A) ફોર્મ નં. 46 B) ફોર્મ નં. 47
C) ફોર્મ નં. 48 D) ફોર્મ નં. 45

125. સામાન્ય રીતે રાજયપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ?
A) 2 B) 1 C) 4 D) 3

126. રાજયમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં જણાવેલ છે ?
A) 243 A B) 243 (f) C) 243 (g) D) 243 B (1)

127. દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં (Artical) માં છે ?
A) 243 C (2) B) 243 C (3) C) 243 C (4) D) 243 D (1)

128. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ?
A) 2 (17) B) 2 (16) C) 2 (15) D) 2 (18)

129. જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે?
A) 11 (5) B) 11 (3) C) 11 (1) D) 11 (4)

130. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે?
A) અનુસૂચિ - 2 અને 4 B) અનુસૂચિ - 3 અને 4
C) અનુસૂચિ - 1, 2 અને 3 D) અનુસૂચિ - 1 અને 4

110)A, 111)B, 112)B, 113)B, 114)D, 115)A, 116)B, 117)D, 118)B, 119)B, 120)B, 121)D, 122)C, 123)B, 124)D, 125)A, 126)D, 127)D, 128)A, 129)D, 130)C.

131. નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો.
A) ગામમાં દિવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત
B) મકાનોને નંબર આપવા બાબત
C) અહીં દર્શાવેલ બધી જ બાબતો
D) પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત

132. નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ - 4)ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ?
A) અનુસૂચિ - 2 B) અનુસૂચિ - 3
C) અનુસૂચિ - 4 D) અનુસૂચિ - 1

133. મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ?
A) 30 B) 35 C) 40 D) 25

134. "એકત્રિત ગામ" જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ" ના કેટલા મહિનાની અંદર "એકત્રિત ગામ" ની પંચાયત રચવી જોઈએ?
A) બે B) ત્રણ C) ચાર D) એક

135. ગુજરાત મૂલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય?
A) 20 B) 15 C) 10 D) 30

136. જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?
A) 103 B) 104 C) 105 D) 102

137. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?
A) 109 B) 110 C) 111 (1) D) 108

138. નાણાપંચની ભલામણ અનુસાર ક્યા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ?
A) 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે
B) 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે
C) 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે
D) 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે

139. તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ?
A) દર બે માસે B) દર ત્રણ માસે
C) દર ચાર માસે D) દર માસે

140. ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ?
A) અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી
B) પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી
C) અહીં દર્શાવેલ બધી જ બાબતો
D) સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી

141. રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યું ફંડ સ્થાપવાનું હોય છે ?
A) જિલ્લા ગામ ઉત્તેજના ફંડ B) જિલ્લા વિકાસ ફંડ
C) રાજ્ય સમકારી ફંડ D) જિલ્લા સમકારી ફંડ

142. ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ?
A) 90 B) 60 C) 45 D) 120

143. દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?
A) ચાર વર્ષ B) પાંચ વર્ષ C) છ વર્ષ D) ત્રણ વર્ષ

144. ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે ક્યા નિયમમાં જણાવેલ છે?
A) 3 B) 4 C) 5 D) 2

145. સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે?
A) 2 B) 3 C) 4 D) 1

146. ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ?
A) 6 B) 7 C) 8 D) 5

147. પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં કરવામાં આવેલી છે ?
A) 243 K (2) B) 243 K (3) C) 243 D (2)(3) D) 243 D (1)

148. ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં 'ફરજ'ની વ્યાખ્યા ક્યા પ્રકરણમાં આપેલી છે ?
A) પ્રકરણ - 3 B) પ્રકરણ - 2 C) પ્રકરણ - 4 D) પ્રકરણ - 1

149. વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ?
A) 30 જૂન B) 30 સપ્ટેમ્બર
C) 31 ડિસેમ્બર D) 31 માર્ચ

131)C, 132)A, 133)A, 134)C, 135)C, 136)C, 137)C, 138)D, 139)B, 140)C, 141)C, 142)C, 143)B, 144)A, 145)D, 146)A, 147)C, 148)B, 149)D.

150. તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ ક્યા અધિકારીને સોંપવામાં આવેલ છે ?

A)જિલ્લા રજીસ્ટ્રાર B) મામલતદાર

C)પ્રમુખશ્રી,, જિલ્લા પંચાયત D)તાલુકા વિકાસ અધિકારી

151. ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ?

A)3 B)4 C)5 D)2

152. દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં ક્યો સુધારો કરવામાં આવેલો હતો ?

A)73 B)74 C)75 D)72

153. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં છે ?

A)17 B)18 C)19 D)16

154. ગુજરાત મૂલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ?

A)ગ્રામવિકાસ કમિશનર B) મનોરંજન કર કમિશનર

C)તાલુકા વિકાસ અધિકારી D)જિલ્લા કલેક્ટર

GPSC Class - 2 - 16/04/2017

155. ગુજરાત રાજયમાં, રાજયમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે?

A)ગુજરાત રાજય પંચાયત પરિષદ

B)વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર

C)ભારત સરકારનું ચૂંટણીપંચ

D)રાજયનું ચૂંટણી પંચ

GPSC Class - 2 - 02/04/2017

156. પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ?

A)1/4થી ઓછી ન હોય તેટલી

B)1/2થી ઓછી ન હોય તેટલી

C)1/3થી ઓછી ન હોય તેટલી

D)આવી જોગવાઈ સંવિધાનમાં નથી

157. પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના ક્યા ભાગમાં કરવામાં આવેલી છે ?

A)ભાગ-4 B)ભાગ-9 C)ભાગ-8 D)ભાગ-7

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

158. "સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા" તરીકે કોણ પ્રસિદ્ધ છે?

A)લોર્ડ રીપન B)લોર્ડ કર્ઝન

C)લોર્ડ કોર્નવોલિસ D)લોર્ડ વિલિયમ બેન્ટિક

159. ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ?

A)જીવરાજ મહેતા B) રસિકલાલ પરીખ

C)બળવંતરાય મહેતા D)લાભશંકર મહેતા

160. નીચેના પૈકી કઈ સમિતિ/સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?

1) રિખવદાસ શાહ સમિતિ 2) ઝીણાભાઈ દરજી સમિતિ

3) ખોડીદાન ઝુલા સમિતિ 4) ડૉ.મિશ્રા સમિતિ

A)ફક્ત (1) B)ફક્ત (2)

C)ફક્ત (1) અને (2) D)ઉપરની તમામ

161. ગામના તલાટીએ વાર્ષિક મહેસુલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે.?

A)31 માર્ચ B)31 જુલાઈ C)31 ઓગસ્ટ D)31 ડિસેમ્બર

162. "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે."

ઉપરનું વિધાન કોનું છે ?

A)જયપ્રકાશ નારાયણ B) ગાંધીજી

C)વિનોબા ભાવે D)બળવંતરાય મહેતા

163. તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણે કરે છે ?

A)રાજ્ય ચૂંટણી પંચ B)જિલ્લા વિકાસ અધિકારી

C)તાલુકા વિકાસ અધિકારી D)વિકાસ કમિશ્નર

164. નીચેના પૈકી ક્યા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી?

A)જમ્મુ અને કાશ્મીર B)નાગાલેન્ડ

C)પંજાબ D)કેરળ

GPSC Class - 2 - 04/03/2017

165. કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ?

A)અશોક મહેતા સમિતિ B)બળવંતરાય મહેતા સમિતિ

C)પી.કે. થુંગન સમિતિ D)જી.વી.કે.રાવ સમિતિ

150)B, 151)D, 152)A, 153)D, 154)C, 155)D, 156)C, 157)B, 158)A, 159)B, 160)C, 161)B, 162)A, 163)D, 164)B, 165)D.

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

166. આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ?
A)ગવર્નીંગ બોડી B)કારોબારી સમિતિ
C)વિજિલન્સ અને મોનિટરીંગ સમિતિ
D)પાણી સમિતિ

167. પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કઈ સ્વાયત્ત સંસ્થાની રચના કરી છે ?
A)જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી B)મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થા
C)ગ્રામીણ વિકાસ સંસ્થા D)સામાજિક વિકાસ સંસ્થા

168. સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે?
A)15 દિવસ B)30 દિવસમાં C) 60 દિવસમાં
D)90 દિવસમાં

169. ગ્રામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ?
A)કલેક્ટર B)સરપંચ
C) જિલ્લા વિકાસ અધિકારી D)તલાટી

170. સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે?
A)જિલ્લા વિકાસ અધિકારી B)તાલુકા વિકાસ અધિકારી
C)રાજ્ય ચૂંટણી પંચ D)કલેક્ટર

171. ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા?
A)સવિતા રાની B)આશાપુર્ણા દવે
C)સુધાબેન કાશીભાઈ પટેલ D)સુરેખા મોતીલાલ યાદવ

172. ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ?
A)1 મે, - ગુજરાત સ્થાપનાનો દિવસ
B)2 ઓક્ટોબર- ગાંધી જયંતિ
C)26 જાન્યુઆરી- પ્રજાસત્તાક દિન
D)12 ફેબ્રુઆરી- સર્વોદય દિન

173. ભારત સરકારે કયા વર્ષને 'ગ્રામસભા વર્ષ' તરીકે જાહેર કર્યું હતું?
A)1989-90 B)1999-2000
C)1995-1996 D)2000-2001

174. ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ?
A)ઈ.સ.1962 B)ઈ.સ.1958 C)ઈ.સ.1952 D)ઈ.સ.1965

175. ગુજરાતમાં કેટલી જિલ્લા પંચયતો આવેલી છે ?
A)169 B)33 C)249 D)21

176. ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો ?
A)19 ઓગસ્ટ, 1993 B)15 એપ્રિલ, 1994
C)1 જૂન, 1993 D)24 એપ્રિલ, 1993

177. પંચાયતી રાજના 3 મહત્ત્વના તબક્કામાં ઈ.સ.1959થી 1964નો તબક્કો કેવો ગણાય છે ?
A)ચઢતીનો તબક્કો B)સાતત્યપૂર્ણ તબક્કો
C)પડતીનો તબક્કો D)અનિયમિતતાનો તબક્કો

178. બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ?
A)24 નવેમ્બર, 1957 B)1 નવેમ્બર, 1958
C)2 ઓક્ટોબર, 1960 D)2 ઓક્ટોબર, 1952

179. પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા યોગ્ય રીતે જોડો.

પંચાયત	ચૂંટાયેલ પ્રતિનિધિ
1) જિલ્લા પંચાયત	A)સરપંચ
2) તાલુકા પંચાયત	B)જિલ્લા પ્રમુખ
3) ગ્રામ પંચાયત	C)તાલુકા પ્રમુખ

A)1-c, 2-b, 3-a B)1-b, 2-a, 3-c
C)1-b, 2-c, 3-a D)1-a, 2-b, 3-c

180. પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં .... બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
A)50 % B)45 % C)30 % D)100 %

181. આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ?
A)બળવંતરાય મહેતા સમિતિ B)જી.વી.કે.રાવ સમિતિ
C)રામસિંગ પુનિયા સમિતિ D)દિલીપસિંહ ભૂરિયા સમિતિ

182. આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?
A)100 ટકા B)70 ટકા C)50 ટકા D)30 ટકા

183. પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્ત્વની સમિતિઓને વર્ષ સાથે જોડો.

1. બળવંતરાય મહેતા સમિતિ	A)1977
2. અશોક મહેતા સમિતિ	B)1972
3. રિખવદાસ શાહ સમિતિ	C)1957

A)1-b, 2-a, 3-c B)1-b, 2-c, 3-a
C)1-c, 2-b, 3-a D)1-c, 2-a, 3-b

184. 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?
A)શિક્ષણ સંસ્થા B)સહકારી સંસ્થા
C)પંચાયતી રાજ સંસ્થા D)ખાનગી સંસ્થા

185. પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?
A)ગ્રામ પંચાયત B)તાલુકા પંચાયત
C)જિલ્લા પંચાયત D)ઉપરના તમામ

166)D, 167)A, 168)B, 169)A, 170)A, 171)C, 172)D, 173)B, 174)C, 175)B, 176)B, 177)B, 178)A, 179)C, 180)A, 181)D, 182)C, 183)D, 184)C, 185)A.

GPSC Class - 2 - 5/3/2017

186. "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ ક્યા હતા ?
1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી
2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ
3. સત્તાનું વિકેન્દ્રીકરણ
4. નાણાની ગતિશીલતા
A) 1, 2, 4 B) 2, 3, 4 C) 1, 2 અને 3 D) 1, 2, 3, 4

GPSC Class - 2 - 11/12/2016

187. 'ગ્રામસભા'ની વ્યાખ્યા ક્યા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?
A) 243-A B) 243-B C) 243-C D) 243-D

188. પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમિશનની રચના કરવા માટેની જોગવાઈ ક્યા આર્ટીકલમાં કરવામાં આવેલી છે ?
A) 243-A B) 243-G C) 243-H D) 243-I

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

189. જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ?
A) દર મહિને એક વાર B) દર ત્રણ મહિને એક વાર
C) દર બે મહિને એક વાર D) દર ચાર મહિને એક વાર

GSSSB સર્વેયર - 2016-17

190. ગૌચર ઉપરનું દબાણ હટાવવા ક્યા કાયદાઓનો ઉપયોગ થઈ શકે?
1) ગુજરાત પંચાયત ધારો
2) જમીન મહેસૂલ ધારો
3) ફોજદારી કાર્યવાહી ધારો
4) ગુજરાત જાહેર મિલકતો અનધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારો
ઉપરમાંથી શું સાચું છે ?
A) 1, 2, 3, 4 B) 1, 2, 3 C) 2, 4 D) 1, 4

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

191. તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
A) તાલુકા વિકાસ અધિકારી
B) તાલુકા પંચાયતના પ્રમુખ
C) તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
D) ઉપરનામાંથી કોઈ નહી.

192. જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ?
A) જિલ્લા આયોજન સમિતિ B) તાલુકા આયોજન સમિતિ
C) વહીવટી આયોજન સમિતિ D) B અને C

193. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો?
A) લોર્ડ મેયો B) લોર્ડ કર્ઝન C) લોર્ડ રિપન D) રોયલ કમિશન

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

194. ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે?
A) ચોખ્ખા 5 દિવસ B) ચોખ્ખા 3 દિવસ
C) ચોખ્ખા 7 દિવસ D) ચોખ્ખા 4 દિવસ

195. આપણા દેશમાં 'પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે ?
A) એક - સ્તરીય B) ત્રિ - સ્તરીય
C) પંચ - સ્તરીય D) દ્વિ- સ્તરીય

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

196. દરેક ગામડામાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે ? - એક

197. કોઈ પંચાયતનો ભંગ કરવામાં આવે તો ત્યારપછી ત્યાં કેટલા સમયમાં ચૂંટણી કરાવવી ફરજિયાત છે ? - છ માસ

198. ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે કોણે ઓળખાવી હતી ? - સર ચાર્લ્સ મેટકાફ

199. ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયતો છે - આ વિધાન કોણે ઉચ્ચાર્યું છે ? - મહાત્મા ગાંધી

પોલીસ કોન્સ્ટેબલ - 2012

200. 'પંચાયતી રાજ' પ્રણાલી ક્યા સિધ્ધાંત પર આધારીત છે? - સત્તાના વિકેન્દ્રી કરણ

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

201. જે ગ્રામ પંચાયતના સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય તેને કેવી ગ્રામ પંચાયત કહે છે ? - સમરસ ગ્રામ પંચાયત

202. ગામડાં માટે લોકભાગીદારી, લોકસશક્તિકરણ, ગરીબો અને મહિલાઓને રજૂઆતની તક ઉપરાંત સરકાર, અધિકારીઓ, કર્મચારીઓનું લોકો સાથે સીધું જોડાણ એટલે.... - ગ્રામસભા

203. ભારતમાં પંચાયતી રાજના પુરસ્કર્તા કોણ ગણાય છે ? - બળવંતરાય મહેતા

204. નીચેના પૈકી જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ ગણાય છે ? - જિલ્લા વિકાસ અધિકારી (DDO)

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

205. ગુજરાત સરકારે નક્કી કરેલા ધોરણ અનુસાર દરેક ગ્રામ પંચાયતમાં ગૌચર માટે કેટલી જમીન હોવી જોઈએ? - 100 ઢોર માટે 40 એકર

186)C, 187)A, 188)D, 189)B, 190)A, 191)B, 192)D, 193)C, 194)B, 195)B.

પ્રોબેશન ઓફિસર - 2016

206. ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે- આ વિધાન કોણે આપેલ છે ? - **અશોક મહેતા સમિતિ**

207. કઈ સમિતિની ભલામણોને આધારેદેશના અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો થયો ? - **ભુરિયા સમિતિ**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

208. ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ? - **પાંચ વર્ષ**

મહેસૂલી તલાટી - 2014

209. ભારતમાં કઈ સાલથી પંચાયત રાજ્યની સ્થાપના થઈ છે ? - **1959**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

210. પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર નાગરિકની ઉંમર કેટલી હોવી જોઈએ ? - **21 વર્ષ કે તેથી વધુ**

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

211. પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટિના અહેવાલ બાદ આવ્યું ?
- બળવંતરાય મહેતા કમિટી

212. બંધારણના કયાં અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?-**243**

213. કઈ બાબતનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ છે ? - **લઘુ સિંચાઈ, પરિવાર કલ્યાણ, ગ્રામ વીજળીકરણ**

214. પંચાયતી રાજના મૂળ સિધ્ધાંત પ્રમાણે પંચાયતી રાજની સફળતા માટે શું મહત્વનું છે? - **પંચમાં ત્રણ પુરુષ અને બે મહિલા સભ્યો હોવા જોઈએ.**

215. ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? - **પાંચ**

216. ગ્રામ પંચાયતની રચના માટે જરુરી એવી (ઓછામાં ઓછી વસ્તી) વસ્તી કોઈ ગામ ધરાવતું ન હોય તો તેણે પંચાયત રચવા શું કરવું પડે ? - **જે ગામમાં જરુરી વસ્તી હોય તેવા ગામ સાથે જોડાઈ સંયુકત પંચાયત રચી શકાય**

217. ગ્રામ પંચાયત વર્ષમાં કેટલીવાર અને ક્યારે ગ્રામસભા બોલાવે છે ? - **વર્ષમાં ત્રણ વાર, એપ્રિલ, ઓગસ્ટ અને નવેમ્બરમાં**

218. કયાં રાજ્યમાં પંચાયતી રાજવ્યવસ્થા નથી ?
- નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ

નાયબ મામલતદાર/DY.S.o - 2012

219. પંચાયતી રાજ સંદર્ભે કયું વિધાન માન્ય રાખવાપાત્ર છે? - **સને 1952માં ગ્રામવિસ્તાર વિકાસ માટે ગ્રામજનોનો સહકાર લઈ સામૂહિક વિકાસ કાર્યક્રમોની શરુઆત એ પંચાયતરાજનો પાયો ગણાય, સને 1957માં ગ્રામવિસ્તાર વિકાસની સામૂહિક વિકાસ યોજનાના અપેક્ષિત ફળ ન મળતાં બળવંતરાય મહેતાના અધ્યક્ષ પદે પેટા સમિતિની રચના કરાઈ,સને 1987માં પંચાયતી રાજને મજબૂત કરવા લોકસભામાં વિધેયક રજૂ કરાયુ**

220. 73માં પંચાયતી રાજ બંધારણીય સુધારણા સંબંધમાં કઈ બાબત સાચી છે? - **18 વર્ષની વય પૂર્ણ કરેલ નાગરિકને મતાધિકાર, રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ગેરલાયક ઠરેલ સભ્ય પંચાયતનો સભ્ય બની શકે નહીં**

221. બંધારણનો 73મો સુધારો અધિનિયમ 1992 જેનું લક્ષ્ય દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનું છે, જે નીચેનામાંથી કઈવ્યવસ્થા કરે છે?
- રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ પંચાયતોની ચૂંટણી કરવી, રાજ્ય નાણાપંચની સ્થાપના કરવી

222. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પધ્ધતિ અપનાવનાર સર્વપ્રથમ રાજ્ય ક્યું ? - **રાજસ્થાન**

223. પંચાયતી રાજની ચડતી, પડતી અને સ્થગિતતા સંદર્ભે નીચે પૈકીનો કયો જવાબ સાચો છે? - **1952-64 ચડતી, 1965-69 પડતી અને 1969-77 સ્થગિતતા**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

224. બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?
- નાના પ્રજાસત્તાક એકમો

225. તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે ? - **વિકાસ કમિશનર**

226. ગુજરાતમાં 'પંચાયતી રાજ'નો અમલ કઈ તારીખથી થયો ?
- 01-04-1963

227. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?
- તાલુકા વિકાસ અધિકારી

228. ભારતના બંધારણના 73માં સુધારામાં અનુચ્છેદ 243 (ખ) હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે 'ગ્રામસભા' કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે ? - **પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ**

સબરજિસ્ટ્રાર - 2013

229. જિલ્લા પંચાયતના પ્રમુખને……ચૂંટે છે ? - **જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બહુમતિથી**

230. ભારતમાં પંચાયતીરાજની સ્થાપનાની ભલામણ કરવા સૌ પ્રથમ કઈ સમિતિની રચના કરવામાં આવી ?
- બળવંતરાય મહેતા સમિતિ

231. ગ્રામ પંચાયતમાં……..સરપંચને ચૂંટે છે ?
- સીધે સીધા પ્રજા મત આપીને

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

232. ગ્રામપંચાયતના વહીવટી વડા કોણ છે? - **તલાટી-કમ-મંત્રી**

233. તાલુકા પંચાયતના વડાને શું કહે છે? - **તાલુકા પ્રમુખ**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

234. ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાંત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ? - **પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996**

235. ગુજરાત પંચાયત ધારા-1993 અનુસાર ગ્રામ સભામાં નિર્ણય કઈ રીતે થાય ? - **હાજર સભ્યોની બહુમતીથી**

236. જિલ્લાની વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરતી વખતે માળખાગત સવલતોનો સંકલિત વિકાસનું ધ્યાન કોણે રાખવાનું હોય છે ? - **જિલ્લા આયોજન સમિતિ**

237. પંચાયતની મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે ? - **પંચાયતની મુદત પૂરી થતી હોય તેના બે મહિના અગાઉ**

238. પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણીય સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? - **રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.**

239. કઈ સમિતિએ ગ્રામ પંચાયતોના વિકાસ માટે યોજનાઓ તૈયાર કરવાની હોય ? - **જિલ્લા આયોજન સમિતિ**

240 સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? - **ઝીણાભાઈ દરજી સમિતિ**

241. અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ? - **ભુરિયા સમિતિ**

242. પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - **અનુચ્છેદ-243-D**

243. 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 હેઠળ પંચાયતની તમામ બેઠકો ભરવાની જોગવાઈ છે ? - **સીધી ચૂંટણી દ્વારા પસંદ થયેલ વ્યક્તિઓથી**

244. ગુજરાતના આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈઓ કેવી રીતે કરવામાં આવી છે ? - **ગુજરાત પંચાયત ધારો-1993માં સુધારો**

245. ગ્રામ્ય વિસ્તારોમાં દ્વિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? - **અશોક મહેતા સમિતિ**

246. DRDAનું આખું નામ જણાવો. - **જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી**

247. ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ? - **સરપંચ**

248. ગામના લોકો ગ્રામ પંચાયતની મીટીંગમાં કઈ રીતે હાજરી આપી શકે ? - **પ્રેક્ષક તરીકે**

249. પંચાયતની મુદત પુરી થાય તે પહેલા તેનુ વિસર્જન થયે, રચવામાં આવેલી નવી પંચાયતની મુદત કેટલી હશે ? - **વિસર્જિત પંચાયત ચાલુ રહી હોત તેટલી પાંચ વર્ષમાં બાકીની મુદત**

250. પંચાયતરાજ સિસ્ટમની ભલામણ કોણે કરી હતી ? - **બળવંતરાય મહેતા સમિતિ**

251. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં ક્યા હિસાબી વર્ષનો વહિવટી અહેવાલ રજૂ થાય અને ચર્ચા થાય? - **પાછલા હિસાબી વર્ષનો**

252. 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 હેઠળ રાજ્ય નાણાકીય પંચની સ્થાપનાની જોગવાઈ છે, આ વિધાન ? - **સત્ય છે**

253. પંચાયતની મધ્યવર્તી સ્તરની રચના માટે મહત્તમ વસતી મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે ? - **20 લાખ**

254. પંચાયતી રાજ સંસ્થાઓને લગતી એલ.એમ.સિંઘવી સમિતિની ભલામણોમાં સૌથી અગત્યની ભલામણ શું હતી ? - **ચૂંટણીઓમાં રાજકીય પક્ષોની સામેલગીરી નહીં**

255. જિલ્લાની વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરતી વખતે પ્રાપ્ય સંસાધનોના પ્રકાર અને તેમનું પ્રમાણનું ધ્યાન કોણે રાખવાનું હોય છે ? - **જિલ્લા આયોજન સમિતિ**

256. ભારતમાં પ્રથમ વખત...... અધિનિયમ અન્વયે સ્થાનિક સ્વરાજ્યને પ્રાંતિય વિષય તરીકે જાહેર કરવામાં આવ્યો. - **ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935**

257. પંચાયતોને નાણાકીય સ્વતંત્રતા નથી, આ વિધાન. - **સાચું છે**

258. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં ક્યા ઓડિટની નોંધ રજૂ થાય અને તેના પર ચર્ચા થાય ? - **છેલ્લા ઓડિટની નોંધ**

259. પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે ક્યો કાયદો લાગુ પડે છે ? - **લોકપ્રતિનિધિત્વ ધારો**

260. ક્યું બંધારણની અગિયારમી અનુસૂચિમાં છે ? - **ગ્રામિણ ગૃહનિર્માણ, પીવાનું પાણી, સામુદાયિક મિલકતની જાળવણી**

261. ગુજરાતમાં પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં સ્ત્રીઓના આરક્ષણની ટકાવારી........ છે. - **50%**

262. કયા રાજ્યને 73મો સુધારો અધિનિયમ, 1992 લાગુ પડતો નથી? - **મિઝોરમ**

263. બંધારણના ક્યા ભાગમાં પંચાયતીરાજ વ્યવસ્થાનું વર્ણન છે ? - **ભાગ-09**

264. રાષ્ટ્રીય બ્રોડબેન્ડ અભિયાન હેઠળ સરકારે ક્યા વર્ષ સુધીમાં તમામ ગ્રામ પંચાયતોને 1 gbpsની ઈન્ટરનેટ સ્પીડ પૂરી પાડવાનો ધ્યેય નિશ્ચિત કર્યો છે ? - **2020**

265. કોની ભલામણથી ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી ? - **બળવંતરાય મહેતા સમિતિ**

266. પંચાયતીરાજનું સૌથી નાનું એકમ ક્યું છે ? - **ગ્રામ પંચાયત**

267. પંચાયતીરાજની શરૂઆત સૌપહેલા ક્યા રાજ્યમાં થઈ હતી ? - **રાજસ્થાન**

268. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા હોવી જોઈએ ? - **7**

269. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે ? - **તલાટી કમ મંત્રી**

270. પંચાયતોને જેટલી વધુ સત્તા અપાશે તેટલું પ્રજાનું વધુ ભલું થશે. આ વાક્ય કોણ બોલે છે ? - **ગાંધીજી**

271. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં ક્યું વાર્ષિક પત્ર મુકાય અને તેના પર ચર્ચા થાય ? - **હિસાબોનું વાર્ષિક પત્રક**

272. 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 હેઠળ તમામ પંચાયતની ચૂંટણીઓ યોજવા શેની જોગવાઈ છે ? - **રાજ્ય ચૂંટણી પંચ**

273. ગ્રામ પંચાયતાનો કાર્યકાળ કેટલો હોય છે ? - **5 વર્ષ**

274. 'રાષ્ટ્રીય પંચાયત દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? - **24મી એપ્રિલ**

275. પંચાયની ચૂંટણીનો નિર્ણય કોણ લે છે ? - **રાજ્ય સરકાર**

276. રાજ્ય સરકારને જિલ્લાની વિકાસ યોજનાનો મુસદ્દો મોકલવાનો હોય ? - **જિલ્લા આયોજન સમિતિએ**

277. ગ્રામ પંચાયતની મીટીંગના તારીખ, સ્થળ અને સમય કોણ નક્કી કરે છે ? - **સરપંચ**

278. પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ? - **24 એપ્રિલ**

279. વિસર્જિત પંચાયતોની બાકી મુદત કેટલાથી ઓછી હોય તો, તે માટે ચૂંટણી કરવાની રહેશે નહી ? - **6 માસ**

280. પંચાયતની જોગવાઈ ક્યાં ક્યા રાજ્યને લાગુ પડતી નથી ? - **નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય**

281. પંચાયતની ચૂંટણી કોણ કરાવે છે ? - **રાજ્ય ચૂંટણી પંચ**

282. ગ્રામસભા શું છે ? - **ગ્રામ સ્તરે પંચાયતના વિસ્તારમાં મતદાર યાદીઓમાં નોંધાયેલી વ્યક્તિઓની સંસ્થા**

283. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં કોણ નક્કી કરે તે બાબત રજૂ થાય અને તેના પર ચર્ચા થાય ? - **તાલુકા પંચાયત**

284. ગુજરાત પંચાયત ધારા-1993 અનુસાર ગ્રામ પંચાયત વધુમાં વધુ કેટલા વ્યક્તિઓને પોતાની બેઠકમાં નિમંત્રી શકે? - **બે**

285. 73મો બંધારણ સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? - **1996**

286. પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ ? - **21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ**

287. ક્યા સ્તરની સામાજિક ન્યાય સમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? - **જિલ્લા પંચાયત**

288. PESA શા માટે ઘડાયો ? - **આદિવાસી વિસ્તારોમાં પંચાયતો માટે વિશેષ જોગવાઈ કરવા.**

289. તલાટીની કામગીરી વિશે ગ્રામ સભા કરી શકે. - **કામગીરીની ચર્ચા**

290. જિલ્લાની વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરતી વખતે પર્યાવરણનું જતન થાય તેનું ધ્યાન કોણે રાખવાનું હોય છે ? - **જિલ્લા આયોજન સમિતિ**

291. ગ્રામ પંચાયતના ગ્રામ ફંડમાં કઈ રકમો જમા થાય છે ? - **અદાલત હુકમ કરે તે, અદાલતે વળતર તરીકે આપેલી તથા ગ્રામ પંચાયતે નાખેલા વેરાની રકમ.**

292. પંચાયતોની ચૂંટણી કોની નિગેહબાની હેઠળ યોજાય છે? : **રાજ્ય ચૂંટણી પંચ**

293. ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ? : **જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.**

294. ગુજરાત વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ? : **ગુજરાત પંચાયત ધારો - 1961**

295. પંચાયતમાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે ? - **અનુચ્છેદ-243**

296. જિલ્લાની વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરતી વખતે ભૌતિક અને પ્રાકૃતિક સંસાધનોનું ધ્યાન કોણે રાખવાનું હોય છે ? - **જિલ્લા આયોજન સમિતિ**

297. પંચાયત વહેલી વિસર્જન થયા બાદ પુનઃગઠન થયેલી પંચાયત ફક્ત બાકી રહેલા સમયગાળા પુરતી જ ચાલુ રહેશે, આ વિધાન... - **સત્ય છે**

298. અનુસૂચિત વિસ્તારોમાં દારૂની દુકાનો માટે ગ્રામસભાની મંજૂરી ફરજિયાત કઈ વડી અદાલતે કરી ? - **હૈદરાબાદ વડી અદાલત**

કમ્પ્યૂટર

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. નીચેનામાંથી ક્યો વિકલ્પ Coutrol Panelમાં જોવા મળતો નથી?
   A) Sound B) Mouse C) Display D) My Account
2. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?
   A) હાયપર લિંક B) માસ્ટર લિંક
   C) જોઈન્ટ લિંક D) કેસ્કેડિંગ લિંક
3. GUIનું પૂરું નામ શું છે ?
   A) Graphical User Interface
   B) Geographical user of Internet
   C) Giga uses internet
   D) Graphics Unlimited interface
4. XMLનું પૂરુ નામ શું છે ?
   A) Extensible Markup Language
   B) Extreme Memory Language
   C) Extensible Memory Line
   D) Extra Markup Language
5. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ?
   A) IMPRESS B) WRITER
   C) CALC D) A, B, Cમાંથી એકપણ નહીં

રેવન્યૂ તલાટી - 28/02/2016

6. MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
   A) Tools →Hide Slide B) Viwe →Hide Slide
   C) Format →Hide Slide D) Slide Show→Hide Slide
7. MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
   A) F6 B) F7 C) F8 D) F9
8. Modemનું પૂરું નામ શું છે ?
   A) modulo-demodulo B) modulation-demodulation
   C) modulator-demodulator D) modulation-demodulating

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

9. કમ્પ્યૂટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
   A) 9 અને 10 B) 1 અને 11 C) 0 અને 1 D) 1 અને 100

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

10. કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે ?
    A) પોર્ટલ B) ફ્રન્ટ પેજ C) હોમપેજ D) વેબ સાઈટ

GPSC MAINS પેપર - 2 - 2016

11. વર્લ્ડ વાઈડ વેબ (www)નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો ?
    A) એલાન ટ્યુરીંગ B) સ્ટીવ જોબ્સ
    C) બીલ ગેટ્સ D) ટીમ બર્નર્સ લી
12. કમ્પ્યૂટરમાં સંગ્રહિત ડેટાના સંદર્ભમાં 'બાઈટ' એટલે શું ?
    A) કમ્પ્યૂટર જેની સાથે કાર્ય કરી શકે તેનો તે ડેટાનો સૌથી નાનો એકમ છે
    B) તે જેની સાથે કમ્પ્યૂટર કાર્ય કરે છે સામાન્ય રીતે આઠ દ્વિ અંકીઓનો સમૂહ છે
    C) પ્રોસેસરની રચના આધારિત કમ્પ્યૂટર કે જેની સાથે કાર્ય કરે છે તેની તે વેરીયેબલ બીટ્સના ડેટાનો સમૂહ છે
    D) ઉપરના પૈકી કોઈ નહી
13. જાણી જોઈને કમ્પ્યૂટર વાઈરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે ?
    A) ડેટા પ્રોટેકશન એન્ડ સીક્યુરીટી એક્ટ, 1997
    B) ઈન્ફોર્મેશન સીક્યુરીટી એક્ટ, 1998
    C) ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000
    D) કમ્પ્યૂટર મીસયુઝ એન્ડ સાયબર એક્ટ, 2009
14. અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યૂટર : અનુપમ અમેય (Anupam-Ameya) .... દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
    A) BARC B) CSIR C) TIFR D) DST

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

15. નેશનલ એરોનોટીક્સ લેબોરેટરીઝ, બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ?
    A) PACE B) CHIPP-16
    C) FLO SOLVER D) MACH

PSI GK - 1/1/2017

16. કમ્પ્યૂટરમાં USBનું પૂર્ણરૂપ શું છે ?
    A) Universal Security Block B) Universal Serial Bus
    C) Universal Software Barrier
    D) Universal Stage Base

1)D, 2)A, 3)A, 4)A, 5)B, 6)D, 7)B, 8)C, 9)C, 10)C, 11)D, 12)B, 13)C, 14)A, 15)C, 16)B.

PSI GK - 4-3/5-3/2017

17. કોમ્પ્યૂટર મોનિટરને .... પણ કહેવાય છે.
A)DVU B)VDU C)UVD D)CCTV

18. કોમ્પ્યૂટરની મેમરીના એકમને ચઢતા ક્રમમાં ગોઠવો :
A)TB>MB>GB>KB B)MB>GB>TB>KB
C)TB>GB>MB>KB D)GB>MB>KB>TB

19. નીચેનામાંથી ક્યું સાચુ નથી ?
A)ડિલીટ કરેલી ફાઈલ રિસાઈકલ બિનમાં મળે છે.
B)રિસાઈકલ બિનમાંથી કોઈપણ ફાઈલને રિસ્ટોર કરી શકાય છે.
C)ફાઈલોને રિસાઈકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે.
D)Right Click દબાવીને "empty recycle bin" ચયન કરતાં એક વારમાં તે ક્લીયર થઈ જાય છે.

20. નીચેનમાંથી ક્યો એપ્લીકેશન સોફ્ટવેર નથી ?
A)વિન્ડોઝ NT B) પેજ મેકર C) વિનવર્ડ XP D)ફોટોશોપ

21. ક્યો પ્રોગ્રામ મોટી ફાઈલને નાની ફાઈલમાં કમ્પ્રેસ કરી નાખે છે.
A) Winzip B) Winspread C) Winstyle D) Winmicro

22. નીચેનામાંથી કઈ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?
A)DOS B)Linux C) Windows D) Oracle

23. રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે ?
A)Press Delete Key B) Press Shift + Delete Key
C) Press Ctrl + Delete Key D) Press Alt + Delete Key

24. Virtual Memory સામાન્ય રીતે .... માં સ્થિત હોય છે.
A)RAM B)CPU
C)Flash Card D)Hard Drive

25. તમે માઉસનું સેટીંગ ક્યાંથી બદલી શકો છો ?
A)Setting >> mouse B) Hardware setting
C) Control Panel >> mouse D) આ ત્રણમાંથી એકપણ નહીં

26. ઈન્ટરનેટ એક્સપ્લોરર :
A)તે એક ઈન્ટરનેટ બ્રાઉઝર છે.
B)તેને વિન્ડોઝ OS ઉપલબ્ધ કરાવે છે.
C)વર્લ્ડવાઈડ વેબ સાઈટ એક્સેસ પોઈન્ટ છે.
D)આપેલ તમામ

27. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કિ કઈ છે ?
A)Ctrl + F4 B) Ctrl + F5 C) Alt + F6 D) Alt + F7

28. નોટપેડનું ડિફોલ્ટ ફાઈલ એક્સટેન્શન શું છે ?
A).doc B).html C).txt D).tif

29. MS Window ઓપરેટીંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો?
A)1975 B)1985 C)1995 D)2000

કોન્સ્ટેબલ - 23/10/2016

30. 1024 બીટ્સ = ...
A)1 KB B)1 MB C)1 TB D)એક પણ નહીં

31. WANનું પુરૂનામ લખો.
A) Wireless Are Network B) Wall Area Network
C) Wide Area Network D) Wi-Fi Area Network

32. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે ?
A)URL B)DMP C)BPM D)URK

33. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેટ શોધ એન્જીન નથી ?
A)Google B) Yahoo ! C) Bing D) King

34. ઈમેલમાં CCનો અર્થ શું છે ?
A)Cut & Copy B) Copy Case
C)Carbon Copy D)એક પણ નહીં

35. .... એ ઓપરેટીંગ સિસ્ટમનું નામ નથી.
A)Window XP B) Linux
C) Ubuntu D) Apple

36. વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ થાય ?
A) Word B) Power Point C) Write D) Access

37. OCRનું પૂરું નામ ....
A)ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીશન
B)ઓલ કેરેક્ટર રેકગ્નીશન
C)ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીશન
D)એક પણ નહીં

38. PDFનો અર્થ થાય છે.
A)પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ B) પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ
C)પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ D)એક પણ નહીં

39. ઈન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ .... થાય છે.
A)Internet Service Provider B) Internet Show Provider
C) Internet Speed Provider D) Internet Space Provider

કોન્સ્ટેબલ - 2015

40. CPUનું પૂરું નામ શું છે ?
A)સેન્ટ્રલ પ્રોજેક્ટ યુનિટ B)સેન્ટ્રલ પરફેક્ટ યુનિટ
C)સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ D)સેન્ટ્રલ પબ્લીક યુનિટ

બિન સચિવાલય કલાર્ક - 2016

41. એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયા શું કહે છે ?
A) સર્ફિંગ B) સર્ચિંગ C) મૂવીંગ D) ફાઈન્ડિંગ

17)B, 18)C, 19)C, 20)A, 21)A, 22)D, 23)B, 24)A, 25)C, 26)D, 27)A, 28)C, 29)B, 30)D, 31)C, 32)A, 33)D, 34)C, 35)D, 36)D, 37)A, 38)C, 39)A, 40)C, 41)A.

42. abc@gmail.com માં abc શું છે ?
A) એક્સ્ટેન્સન B) સર્વિસ પ્રોવાઈડર
C) હોસ્ટ નેમ D) યુઝર નેમ

43. LAN નું પુરુ નામ શું છે ?
A) Logged Area Network B) Login Area Network
C) Local Area Network D) LockingAreaNetwork

44. માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?
A) ક્લિક B) ડબલ ક્લિક C) ડ્રેગીંગ D) રાઈટ ક્લિક

45. કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?
A) POIUY B) ASDFG C) QWERT D) ZXCV

46. સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
A) 500 MB B) 600 MB C) 700 MB D) 800 MB

47. CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?
A) Analog B) Digital
C) (A) અને (B) બંને
D) (A) અને (B)પૈકી એકપણ નહી.

48. MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ?
A) Word B) Excel C) Writer D) Access

49. કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?
A) સ્ટોર B) રિસ્ટોર C) અપગ્રેડ D) બેકઅપ

50. કોઈ પણ ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?
A) Change B) Modify C) Rename D) Edit

51. MS Wordમા પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
A) Landscape B) PortraitC) Column D) Row

52. MS Wordમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
A) Ctrl + Alt + '+' B) Ctrl + Shift + '+'
C) Ctrl + Alt + > D) Ctrl + Shift + >

53. એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?
A) LAN B) MAN C) WAN D) FAN

54. કી - બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે ?
A) ડાબી B) જમણી C) ઉપર D) નીચે

55. Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ?
A) F7 B) Ctrl + F7 C) Shift + F7 D) Alt + F7

56. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
A) 1 B) 4 C) 8 D) 16

57. USB નું પુરુ નામ શું છે ?
A) Univesal Source Bus B) Univesal Serial Bus
C) Univesal Section Bus D) Univesal Socket Bus

58. SMPS નું પુરુ નામ શું છે ?
A) Switched Model Power Supply
B) Switched Markup Power Supply
C) Switched Mode Power Supply
D) Switched Modular Power Supply

59. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દૂર કરી શકાય છે ?
A) Disk Cleanup B) Clean Disk
C) Disk Eraser D) Disk Clear

60. નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયુ નામ આપવામાં આવે છે ?
A) Unititled Folder B) New Folder
C) Blank Folder D) Win Folder

61. MS Word માં ફોન્ટ અને ફોન્ટ સાઈઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ?
A) સ્ટાન્ડર્ડ ટૂલબાર B) ફોર્મેટીંગ ટુલબાર
C) ફોન્ટ ટૂલબાર D) ટેક્સ્ટ ટૂલબાર

62. નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ કલાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે ?
A) Internet Express B) Outlook Express
C) Web Express D) Email Express

63. Modem નું પુરુ નામ શું છે ?
A) Modul Demodul B) Modular Demodular
C) Modulator Demodulator D)Modulation Demodulation

64. ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિન્હ મૂકવામાં આવે છે?
A) @ B) . C) $ D) *

બિન સચિવાલય કલાર્ક - 21/12/2014

65. હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે?
A)પ્રોગ્રામ B)ફ્લોચાર્ટ
C)અલ્ગોરિધમ D)ઓપરેટિંગ સિસ્ટમ

66. MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે?
A)SQR ( ) B)SQRT ( ) C)MOD ( ) D)MODE ( )

67. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે ?
A)Bit B)Byte C)KB D)MB

68. MS Excelમાં કુલ કેટલી હરોળ (Row) હોય છે ?
A)64 B)256 C)65526 D)65536

69. ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
A)સ્કેનર B)વેબકેમેરા C)મોનિટર D)પ્રિન્ટર

42)D, 43)C, 44)B, 45)C, 46)C, 47)B, 48)C, 49)C, 50)C, 51)B, 52)D, 53)A, 54)B, 55)C, 56)C, 57)B, 58)C, 59)A, 60)B, 61)B, 62)B, 63)C, 64)B, 65)D, 66)B, 67)A, 68)D, 69)D.

70. HTMLનો ઉપયોગ શેના માટે થાય છે ?
A)ગણતરી માટે B)ગ્રાફ બનાવવા માટે
C)વેબપેજ બનાવવા D)એકેય નહીં

71. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે?
A)સ્ટેટસ બાર B)કંટ્રોલ પેનલ
C)પ્રોગ્રામ D)એરિથમેટિક એન્ડ લૉજિક

72. HTMLમાં FORM બનાવવા ક્યા ટેગનો ઉપયોગ થાય છે?
A)FONT B)FORM C)HREF D)એકેય નહીં

73. કમ્પ્યૂટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ?
A)કંટ્રોલ વ્યુ B)રિસાયકલ બિન
C)ડોક્યુમેન્ટ્સ D)સ્ટેટસ બાર

74. કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?
A)ક્લિક B)ડબલ ક્લિક C)પૉઈન્ટિંગ D)ડ્રેગિંગ

75. MS Wordની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ?
A)ટાઈટલબાર B)મેનૂબાર C)ટાસ્કબાર D)સ્ટેટસબાર

76. કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?
A)ક્લિક B)ડબલ ક્લિક C)પૉઈન્ટિંગ D)ડ્રેગિંગ

77. MS Word ક્યા પેકેજનો એક ભાગ છે ?
A)MS Windos B)MS Office
C)MS OpenOffice D)MS Application

78. Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે?
A)ઈ-મેઈલ ક્લાયન્ટ B)સર્વર ક્લાયન્ટ
C)બ્રાઉઝિંગ ક્લાયન્ટ D)સિસ્ટમ ક્લાયન્ટ

79. ઑપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સૉફ્ટવેર છે?
A)એપ્લિકેશન સૉફ્ટવેર B)સિસ્ટમ સૉફ્ટવેર
C)પ્રોગ્રામ સૉફ્ટવેર D)યુઝર સૉફ્ટવેર

80. ઈ-મેઈલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે ?
A)$ B)@ C)% D)#

81. ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
A)Undo B)Redo C)Copy D)Paste

82. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી?
A)ડેટા ફિલ્ટર B)સ્પેલ ચેક C)વર્ડ કાઉન્ટ D)એકેય નહીં

83. નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી.
A)ગોલ-સીક B)મેઈલ મર્જ C)ફિલ્ટર D)એકેય નહીં

84. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ?
A)શૂન્ય B)ચાર C)બે D)એક

85. નીચેનામાંથી ક્યો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
A)Mozilla Firefox B)Internet Explorer
C)Google Chrome D)આપેલ તમામ

86. વિન્ડોઝ ટાઈટલબારમાં ક્યું બટન જોવા મળે છે ?
A)Check B)Close C)End D)Scroll

87. પુસ્તકોનું ઑનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઈટ કઈ છે?
A)www.onlinebooks.com B)www.amazon.com
C)www.booksonline.com D)ww.amazonbooks.com
(ખરેખર .in આવે)

88. ફાઈલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
A)Cut B)Copy C)Paste D)Move

GPSC પ્રિલિમ - 2001

89. કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ?
A)બિલ ગેઈટ્સ B)બિલ ક્લિન્ટન
C)અબ્દુલ કલામ D)સ્વામીનાથન

90. ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય ?
A)સ્પીડ પોસ્ટ B)કુરિયર મેઈલ
C)ઈ-મેઈલ D)ફેક્સ

91. વેબસાઈટનો સંબંધ કોની સાથે છે ?
A)ટેલિવિઝન B)રેડિયો C)ઈન્ટરનેટ D)પ્રિન્ટિંગ

GPSC પ્રિલિમ - 2007

92. કમ્પ્યૂટરમાં CPUનો અર્થ શું થાય ?
A)સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ B)સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ
C)સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ D)કમ્પ્યૂટર પ્રિન્ટિંગ યુનિટ

93. 'બ્લોગ'નો સંબંધ ક્યા ક્ષેત્ર સાથે છે ?
A)ઈન્ટરનેટ B)પ્રિન્ટિંગ
C)સ્થાપત્ય D)તબીબી વિજ્ઞાન

PSI ખાતાકીય - 23/04/2017

94. ઈમેઈલને ગુજરાતીમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
A)વિજાણુ પેપર B)વિજાણુ એપ્સ
C)વિજાણુ ટપાલ D)A, B, C ત્રણમાંથી એકપણ નહીં

95. પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે ક્યા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે ?
A)COM1 B)COM2 C)USB D)UBS

96. કમ્પ્યૂટરને બંધ કરવા માટે ક્યા વિકલ્પને પસંદ કરશો ?
A)Log off Computer B)Switch off Computer
C)Turn off Computer D)Restart off Computer

70)C, 71)B, 72)B, 73)B, 74)C, 75)D, 76)D, 77)B, 78)A, 79)B, 80)B, 81)A, 82)A, 83)B, 84)C,
85)D, 86)B, 87)B, 88)A, 89)A, 90)C, 91)C, 92)A, 93)A, 94)C, 95)C, 96)C.

97. કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને ક્યા નામથી દર્શાવવામાં આવે છે ?
A)Ctrl B)Alt C) Shift D)PgDn

GPSC Class - 2 - 29/1/2017

98. કોમ્પ્યુટરની "IC Chips" સામાન્યરીતે શામાંથી બનેલી હોય છે?
A)સીસું B)ક્રોમિયમ C)સિલિકોન D)સોનું

GPSC Class - 2 - 12/2/2017

99. લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે?
A)હેમર B)પ્રિન્ટર હેડ C)ટોનર D)લેસર ગન

100. નોટપેડ કયા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે?
A)ડિજીટલ ડાયરી B) Wi-Fi Hotspot
C) Scipt Writer તરીકે D)ઉપરોક્ત બધા જ કામો માટે

101. નીચેના પૈકી કયો વિન્ડોઝ યુટીલીટી પ્રોગ્રામ છે જે ફાઈલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે.
A)બેક અપ B) Disk Clean up
C) Disk Defragmenter D) Disk Restore

102. નીચેના પૈકી કોના ઉપયોગથી રમત ઝડપથી રમી શકાય છે?
A)Mouse B)Key board C) Joy Stick D) RAM

103. કોમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી, જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે. અને અનુક્રમણિકા બની શકે છે?
A) Web Crawlers B) Trojan Horse
C)Spyware D)ઉપરોક્ત પૈકી એક પણ નહી

104. " CPU comprises of Control memory and ....unit." ખાલી જગ્યા પુરો.
A)Microprocessor B) arithmetic/logic
C) Output D) ROM

GPSC Class-1 - 15/01/2017

105. નીચે પૈકી કઈ એપ્લીકેશન ગૂગલે ચેટીંગ માટે લોન્ચ કરી છે?
A)Spike B)IMO C) ALLO D) Hike

GPSC Class - 2 - 16/04/2017

106. પેન્ટીયમ 'Pentium' કોમ્પ્યુટરનાં કયા ભાગ સાથે સંકળાયેલ છે?
A)ડીવીડી B) હાર્ડ ડીસ્ક
C)માઈક્રો પ્રોસેસર D)માઉસ

107. માયક્રોસોફ્ટ ઓફીસ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી?
A)એક્સલ B) પાવર પોઈન્ટ
C)વર્ડ D)એન્ડ્રોઈડ

108. કોમ્પ્યુટર "પ્રીન્ટ પ્રીવ્યુ" "Print Preview" કમાંડ ક્યારે આપવામાં આવે છે?
A)ડોક્યુમેન્ટમાં રંગ પુરવા B) ડોક્યુમેન્ટમાં સેવ કરવા
C) ડોક્યુમેન્ટમાં કોપી કરવા
D)જ્યારે ડોક્યુમેન્ટ પીન્ટ કરવામાં આવશે ત્યારે તે કેવું દેખાશે તે જોવા

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

109. કઈ ભારતીય સંસ્થાએ સુપરકોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું ?
A)વીપ્રો B)ટીસીએસ C)પીઆરએલ D)સી-ડેક

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

110. 'સિસ્ટિમ સોફ્ટવેર' એ શું છે ?
A)વર્ડ પ્રોસેસિંગ B)પ્રોગ્રામ લેંગ્વેજ
C)ગ્રાફીક્સ D)બ્રાઉઝર

111. 'પર્સનલ કમ્પ્યૂટર'માં ક્યા ભાગો આવેલ છે ?
A)ઈનપુટ-આઉટપુટ કોમ્પોનન્ટ B)પ્રોસેસર
C)મેમરી, સ્ટોરેજ D)ઉપરના તમામ

112. 'Network'ના ક્યા પ્રકારો છે ?
A)LAN લોકલ એરીયા નેટવર્ક
B) MAN મેટ્રોપોલીટન એરીયા નેટવર્ક
C) WAN વાઈડ એરિયા નેટવર્ક
D)ઉપરોક્ત બધા જ

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

113. કમ્પ્યુટર માટેની "આઈસી ચીપ્સ" સામાન્ય રીતે શેની બનેલી હોય છે?
A)સીસું B)સિલિકોન C)તાંબુ D)સોનું

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

114. નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી?
A)C++ B)UNIX
C)JAVA D)ઉપરના તમામ

97)A, 98)C, 99)C, 100)D, 101)C, 102)C, 103)A,104)B, 105)C, 106)C, 107)D, 108)D, 109)D, 110)B, 111)D, 112)D, 113)B, 114)B.

115. HTTP નું પૂર્ણ સ્વરૂપ શું છે?
A) Hyper Text Top Protocol
B) High Text Top Protocol
C) Hyper Text Transfer Protocol
D) ઉપરના પૈકી કોઈ નહીં

GPSC Class - 2 - 18/03/2017

116. કોમ્પ્યુટર અને અન્ય સાધનો "UPS" સાથે જોડવામાં આવે છે. "UPS" નું આખું નામ શું છે?
A) યુનાઈટેડ પાર્સલ સર્વીસ B) યુનિફોર્મ પ્રોડક્ટ સર્પોર્ટ
C) અંડર પેનલીંગ સ્ટોરેજ D) અનઈન્ટરપ્ટેડ પાવર સપ્લાય

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

117. WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફીકલ બ્રાઉઝર કયું હતું ?
A) ફાયરફોક્સ B) બેઝીક C) એમએસ-ડોટ D) મોઝેઈક

GPSC Class - 2 - 12/02/2017

118. FORTRAN એ પ્રોગ્રામ માટેની ભાષા છે. FORTRAN એટલે....
A) File Translation B) Format Translation
C) Formula Translation D) Floppy Translation

119. "એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું.
A) સ્ટીવ જોબ્સ B) સ્ટીવ વીઝનીયાક
C) રોનાલ્ડ વૅાયને D) ટીમ કૂક

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

120. નીચે પૈકી કઈ મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?
A) એન્ડ્રોઈડ B) સિમ્બીયન
C) માઈક્રોસોફ્ટ D) GSL (BADA)

121. 1 કિલોબાઈટમાં બિટની સંખ્યા કેટલી હોય છે ?
A) 1000 B) 8192 C) 8000 D) 1024

GPSC Class - 1 - 09/04/2017

122. વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પહેલું કોમ્પ્યુટર કયું હતું ?
A) UNIVAC B) EDSAC C) MANIC D) ENIAC

GPSC Class - 2 - 05/02/2017

123. EEPROM નું પુરૂ નામ શું છે?
A) Electrically Erasable Programmable Read Only Memory
B) Easily Erasable Programmble Read only Memory
C) Electronic Erasable Programmable Read only Memory
D) None of the above

124. Marshmallow એ કયા કોડનું નામ છે?
A) લિનક્સ વર્ઝન B) એન્ડ્રોઈડ વર્ઝન
C) સફારી D) વિન્ડોઝ-10

125. નીચે દર્શાવેલ કઈ કંપનીએ તાજેતરમાં "Yahoo" ને ખરીદેલ છે?
A) માઈક્રોસોફ્ટ (Microsoft) B) એઓએલ (AOL)
C) વેરીઝોન (Verizon) D) પીક્ઝાર (PIXAR)

GSSSB મિકેનિક - 2017

126. નીચેનામાંથી કઈ સમસ્યા કમ્પ્યુટરમાં ઉદ્ભવી શકે છે ?
A) વિશ્વસનીયતા B) કમ્પ્યુટર ક્રાઈમ
C) ચોક્સાઈ D) ઝડપ

127. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ?
A) શૂન્ય B) ચાર C) બે D) એક

GSSSB સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017

128. કમ્પ્યુટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે?
A) સફેદ B) કાળા C) પીળા D) વાદળી

129. ISP Stands for :
A) Internet Survey period B) Integrated srevice provider
C) Internet Service Provider D) Internet Security Protoool

130. CD-ROM Stands for ?
A) Compactable read Only Memory
B) Compact Data Read Only Memory
C) Compactable Dick Read Only Memory
D) Compact Disk Read Only Memory

131. Header files often have the file extension
A) .h B) .he C) .head D) .c

132. Who developed the PHP programming language ?
A) Dennis M. Ritchie B) Dennis P. Ritchie
C) Bjarne Stroystrup D) Rasmus Lerdorf

115)C, 116)D, 117)D, 118)C, 119)D, 120)C, 121)B, 122)A, 123)A, 124)B, 125)C, 126)B, 127)C, 128)C, 129)C, 130)D, 131)A, 132)D.

133. What is RDBMS ?
A) Real Database Management System
B) Random Database Management System
C) Relational Database Management System
D) Real-time Database Management System

134. Most important piece of hardware is
A) RAM B) ROM
C) CPU D) Motherboard

135. Who created the 'c' language ?
A) Dennis Ritchie B) Bjarne Stroustup
C) James Gosling D) None of the above

136. ઈ-મેઈલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયુ ચિન્હ મુકવામાં આવે છે?
A) @ B) . C) $ D) *

GSSSB સર્વેયર - 2016-17

137. MS Wordમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ?
A) Ctrl+F8 B) Alt + F8
C) Shift + F8 D) Ctrl +Alt + F8

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

138. USB નું પુરુ નામ શું છે ?
A) Universal Serial Bus B) Uniform Serial Bus
C) Untitled Serial Bus D) Universal Serial Byte

139. GUI નું પુરું નામ શું છે ?
A) Graphical User Interface
B) Graphical User Internal
C) Graphical Uniform Interface
D) Graphical Universal Interface

140. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ?
A) RAM B) ROM
C) (A) અને (B) બંને D) આપેલ પૈકી એકપણ નહીં

141. નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો.
A) Photo B) Raster C) Clipart D) Bit

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

142. માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ?
A) internet explorer B) Windows Explorer
C) Google Chrome D) Mozilla Firefox

143. <b> સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે ?
A) <bold> B) <strong>
C) <emp> D) A, B, C પૈકી એકપણ નહી

144. HTML દસ્તાવેજો (Document)ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે.
A) વિશિષ્ટ દ્વિઅંકી સ્વરૂપ B) યંત્ર ભાષા સંકેતો
C) ASCII અક્ષર D) A, B, C પૈકી એકપણ નહી

145. ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ?
A) મેઈલ નેમ B) હોસ્ટ નેમ
C) ડોમેઈન નેમ D) સર્વિસ નેમ

146. કોષ્ટકની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે ?
A) UPDATE B) ALTER
C) CHANGE D) A, B, C તમામ

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

147. MS Power Pointમાં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ?
A) F4 B) F5 C) F6 D) F7

148. IPનું પૂરું નામ શું છે ?
A) Information Protocol B) Intranet Protocol
C) internal Protocol D) Internet Protocol

149. બિનજરૂરી મેઈલને કયા નામે ઓળખવામાં આવે છે ?
A) Junk Mail B) Temp Mail
C) Extra Mail D) Trash Mail

150. HTTPનું પૂરું નામ શું છે ?
A) Hyper text transfer protocol
B) Hyper text transformation protocol
C) Hyper text translation protocol
D) Hyper text timeline protocol

151. DNSનું પૂરું નામ શું છે ?
A) Domain Name Section B) Domain Name Store
C) Domain Name System D) Domain Name Selection

152. PDF નું પુરું નામ શું છે ?
A) Portable Document File
B) Portable Document Folder
C) Portable Document Format
D) Portable Document Form

153. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે ?
A) Windows Chat B) Windows conference
C) Windows Messenger D) Windows Outlook

154. Outlook Express કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?
A) ઈ-મેઈલ ક્લાયન્ટ B) સર્વર ક્લાયન્ટ
C) બ્રાઉઝિંગ ક્લાયન્ટ D) સિસ્ટમ ક્લાયન્ટ

133)C, 134)C, 135)A, 136)A, 137)B, 138)A, 139)A, 140)B, 141)B, 142)A, 143)B, 144)C, 145)B, 146)B, 147)B, 148)D, 149)A, 150)A, 151)C, 152)C, 153)C, 154)A.

HTAT - 2014

155. કમ્પ્યૂટર ચાલુ થયા પછી તેને રીફ્રેશ કરવા કઈ કી વપરાય ?
- F5

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

156. MS Word ફાઈલનું એક્સ્ટેંશન શું હોય છે ? - .doc
157. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ?
- WORD
158. મિડિયા પ્લેયર જણાવો. - VLC Media Player, Windows Media Player, Flash Player

કલાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

159. કોમ્પ્યુટર વાઈરસ ? - ડાન્સિંગ હિલેરી, પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક, રેન્સમવેર

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

160. જુદા જુદા પર્સનલ કમ્પ્યૂટર્સનું જોડાણ કરીને શું રચી શકાય ? - નેટવર્ક

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

161. કમ્પ્યૂટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? - સીપીયુ
162. નીચેનામાંથી કમ્પ્યૂટરની ખાસિયત કઈ છે? - ચોકસાઈ, ઝડપ, વિપુલ પ્રમાણમાં સંગ્રહક્ષમતા

પ્રોબેશન ઓફિસર - 2016

163. લિનક્સમાં શબ્દ ગણવા માટે ક્યા કમાન્ડનો ઉપયોગ થાય છે ?
- WC
164. DBMSનું પૂરું નામ શું છે ? - ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ
165. RDBMSમાં R શેના માટે વપરાય છે ? - રિલેશનલ

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

166. કમ્પ્યૂટરમાં ડિજીટલ વર્સેટાઈલ ડિસ્ક એ કેવું સાધન છે ? - સંગ્રાહક

મહેસૂલી તલાટી - 2014

167. ઈન્ટરનેટ સાથે સંકળાયેલ MODEM એટલે શું ? - Modulator Demodulator
168. કોમ્પ્યૂટરમાં IP Address કેટલા બીટનું બનેલું હોય છે ? - 32
169. કોમ્પ્યૂટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતી Excel Sheetમાં કેટલી ઊભી હરોળ હોય છે ? - 3256
170. કોમ્પ્યૂટરમાં વેબસાઈટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. www એટલે શું ? - world wide web

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર કલાર્ક - 2012

171. Motherboardનું બીજું નામ શું છે ? - System Board
172. 'વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર' - Notepad, Wordpad, MS Word
173. 'Windos Explorer' શું છે ? - Web Browser
174. કોમ્પ્યૂટર લેંગ્વેજ ? - Cobol, Lisp, Perl
175. MS Word ડોક્યુમેન્ટમાં બાય ડીફોલ્ટ બોટોમ માર્જિન કેટલા ઈંચ હોય છે? - 2.5
176. Linux ક્યા પ્રકારનું સોફ્ટવેર છે ? - Open Source
177. 'ડેટાબેઝ સોફ્ટવેર' ? - Oracle, MS Access, SQL Server
178. 'ઓપરેટિંગ સીસ્ટમ' (O.S.) ? - Dos, Unix, Mac

જૂનિયર કલાર્ક પેપર - 1 - 2012

179. મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ? - DPI
180. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું ? - Word Star
181. આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ? - Basic, Java, C#

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

182. કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે ? - સિલિકોન

સચિવાલય સિનિયર કલાર્ક - 2016

183. MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે ? - Editing
184. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? - સ્કેનર

સબ ઓડિટર - 2015

185. HTMLમાં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? - WEB BROWSER
186. Ms Excelમાં માહિતીને ચઢતા કે ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ ક્યા મેનૂમાં જોવા મળે છે? - Data
187. HTMLમાં આડી લાઈન દોરવા માટે ક્યા ટેગનો ઉપયોગ થાય છે? - HR
188. સામાન્ય રીતે કોઈપણ ઓબ્જેક્ટને ગતિ આપવાની પ્રક્રિયા ક્યા નામથી ઓળખાય છે? - એનિમેશન
189. સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે ? - 32
190. વેબપેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? - HTML
191. નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ? - LAN, MAN, WAN
192. એક જ બિલ્ડિંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરને જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? - LAN
193. નેટવર્કમાં રહેલા કમ્પ્યૂટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ? - IP એડ્રેસ

સબરજિસ્ટ્રાર - 2013

194. I.P.નું આખું નામ શું છે ? - **ઈન્ટરનેટ પ્રોટોકોલ**

195. કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમનો સાચો ચઢતો ક્રમ જણાવો ? - **નિબલ, બીટ, બાઈટ, કિલોબાઈટ**

196. C.C.C.નું આખું જણાવો ? - **કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ**

PSI - 2012

197. ઈન્ટરનેટમાં HTTPનું પૂર્ણ સ્વરૂપ છે :
- હાઈપર ટેક્સ્ટ ટ્રાંસફર પ્રોટોકોલ

198. ઈસરો દ્વારા બનાવવામાં આવેલ ભારતનું ઝડપી કોમ્પ્યુટર (supercomputer) નીચેનામાંથી કયું છે ? - **સાગા - 220**

199. પેન ડ્રાઈવ (Pen Drive)ની મેમોરી ક્યા પ્રકારની હોય છે ?
- ફ્લેશ મેમોરી

PSI નશાબંધી - 2011

200. માઈક્રોચીપના શોધક ....છે.
- રોબર્ટનોય અને જેક કીલ્બી

201. Excelમાં Rowની Height કેટલી હોય છે ? - **12.75**

202. Kbpsનું આખું નામ નીચેનામાંથી ક્યું છે ?
- Kilo Bites Per Second

203. RAM કમ્પ્યૂટર માટે વપરાતા શબ્દનું પૂરું નામ શું ?
- રેન્ડમ એસેસ મેમરી

204. GUIનું આખું નામ નીચેનામાંથી ક્યું છે ?
- Graphical User Interface

205. Internetનું આખું નામ..........
- Interconnected Network

206. Wordમાં મેઈલમર્જ ઓપ્શન ક્યા મેનુમાં આવે છે ?
- TOOLS

207. કમ્પ્યૂટર સિસ્ટમના ક્યા ભાગને તેનું મગજ કહી શકાય ?
- સી.પી.યુ

208. કમ્પ્યૂટરમાં વાયરસ એટલે શું ?
- વાયરલ ઈન્ફોર્મેશન રિસોર્સ એટ સીજ

209. ડીવીડી એટલે શું ? - **ડીજીટલ વર્સેટાઈલ ડીસ્ક**

આયુર્વેદિક ડોક્ટર - 2000

210. ભારત દ્વારા વિકસાવેલા સુપર કમ્પ્યૂટર પરમ 1000ની સંસ્થાનું નામ શું છે ? - **સી-ડેક**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

211. ઈન્ટરનેટ પર વેબસાઈટ લોન્ચ કરનાર પ્રથમ રાજકીય પાર્ટી કઈ છે ? : **BJP**

212. કમ્પ્યૂટરની સ્ક્રીન પર આવેલા નાના-નાના ટપકાંને શું કહેવાય? : **પિક્સેલ**

213. કમ્પ્યૂટરના શોધક કોણ છે ? : **ચાર્લ્સ બેબેજ**

214. ડિસ્કની બિનજરૂરી ટુકડાવાળી ફાઈલોને દૂર કરીને સારી ફાઈલોને પુનઃ ગોઠવીને ડિસ્કની કાર્યક્ષમતા વધારવાનું કામ પ્રોગ્રામ દ્વારા થાય છે. - **ડિસ્ક ડિફ્રેગમેન્ટર**

215. Ms worldમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ? - **Drop caps**

216. Ms Wordમાં Regular Italics. Bold વગેરે શું છે ? - **font style**

217. Ms Word ફાઈલની પ્રીન્ટ લેતી વખતે બાઈન્ડિંગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? - **Gutter**

218. કમ્પ્યૂટર........ અંક પદ્ધતિનો ઉપયોગ માહિતી સંગ્રહ કરવા અને ગણતરી કરવા કરે છે. - **દ્વિસંગી (બાયનરી)**

219. Ms Wordમાં ફાઈલને Save કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે ? - **3**

220. ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે ? - **સબ ફોલ્ડર**

221. ફોલ્ડરને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે ? - **ડિરેક્ટરી**

222. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યૂટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે ? - **ડાઉનલોડ**

223. કમ્પ્યૂટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે છે ?- **અપલોડ**

224. ચેકની સંખ્યા ઘણી વખત વધારે હોય ત્યારે તેની ચકાસણી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? - **MICR**

225. Modemનું પૂરું નામ શું છે ?- **Modulator Demodulator**

226. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ? - **હાયપર લિંક**

227. કમ્પ્યૂટરમાં સ્થિત કાયમી સ્મરણ શક્તિને શું કહેવાય ? - **ROM**

228. IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ? - **32**

229. ISPનું પૂરું નામ શું છે ? - **Internet Service Provider**

230. વેબસાઈટના અજોડ સરનામાને ક્યા નામે ઓળખવામાં આવે છે ? - **URL**

231. ઈન્ટરનેટમાં દરેક ફાઈલ એકબીજા સાથે કોના વડે જોડાયેલી હોય છે ? - **હાઈપરલિંક**

232. abc@gmai.comમાં Com શું છે ?- **ડોમેઈન નેમ**

233. ટ્રેક બોલ ક્યા પ્રકારનું ડિવાઈસ છે ? - **ઈનપુટ ડિવાઈસ**

234. ઈ-મેઈલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે ? - **યુઝરનેમ**

235. ઈ-મેઈલને ગુજરાતીમાં શું કહે છે ? - **વીજાણું ટપાલ**

236. MS Excel ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ? - **.xls**

237. MS Wordમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેના ભાગમાં ક્યા રંગની વાંકીચૂકી લીટી જોવા મળે છે? - **લાલ**

238. MS Word પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરશો ? - **Alt + F4**

239. સૌપ્રથમ જાણીતું ઈન્ટરનેટ સર્ચ એન્જિન કયું હતું ? - **આર્ચાઈ**

240. ઈન્ટરનેટ પર ઉપયોગ થતી કમ્પ્યૂટર ભાષાને .... કહેવાય છે. - **JAVA**

241. વિન્ડોઝ ડિલીટ કરેલી ફાઈલોને શેમાં સાચવે છે ? - **Recycle Bin**

242. Ms Wordને શરૂ કરવા માટે Runના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર આપશો ? - **winword**

243. Ms Word ડોક્યુમેન્ટની સૌથી નીચેની બારને શું કહે છે ? - **સ્ટેટસ બાર**

244. Ms Wordમાં ફોન્ટ સાઈઝના ડ્રોપઆઉટ લીસ્ટમાં સૌથી મોટી સાઈઝ કેટલી હોય છે ? - **72**

245. Ms Wordમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજીસ્ટર્ડનો લોગો ® ઉમેરી શકાય છે ? - **Ctrl + Alt + R**

246. Ms Wordમાં H_2Oમાં 2ને કઈ અસર આપવામાં આવેલ છે ? - **Subscript**

247. ઓપ્ટીકલ ડિસ્કને ક્યા પ્રકારનું સ્ટોરેજ ગણાય ? - **એક્સ્ટર્નલ સ્ટોરેજ**

248. Ms Wordમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? - **Subscript**

249. Ms Wordમાં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કન્ટ્રોલ બટન્સ જોવા મળે છે ? - **3**

250. તમે જ્યારે ....માં માહિતી સંગ્રહ કરો છો ત્યારે કમ્પ્યૂટર બંધ કર્યા છતા પણ તે માહિતી અકબંધ અને સચવાયેલી રહે છે. - **સેકન્ડરી સ્ટોરેજ ડિવાઈસ**

251. કમ્પ્યૂટરની પરિભાષામાં જીઆઈએફ ફાઈલ શું છે ? - **ગ્રાફીક ઈન્ટરચેન્જ ફોરમેટ**

252. Ms Word ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? - **Ctrl + End**

253. ઈ-મેઈલમાં કઈ કામગીરી ફક્ત એક જ વખત કરવાની હોય છે ? - **Sign up**

254. કી-બોર્ડમાં Backspace કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે ? - **ડાબી**

255. કી-બોર્ડમાં Delet કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે ? - **જમણી**

256. RAMનું પૂરું નામ શું છે ? - **Random Access Memory**

257. કી-બોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઈનમાં ડાબેથી જમણે કીનો ક્રમ ક્યો હોય છે ? - **QWERT**

258. Ms Wordમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? - **Subscript**

259. કમ્પ્યૂટરની પ્રથમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ છે ? - **FORTRAN**

260. MS Wordમાં ફોન્ટ સાઈઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઈઝ કેટલી હોય છે ? - **8**

261. MS Wordમાં Spelling and Grammarની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ? - **F7**

262. Ms Wordમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઈટનો લોગો © ઉમેરી શકાય છે. - **Ctrl +Alt +C**

263. MS Wordમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન ઉપલબ્ધ છે ? - **2**

264. MS Word માં 15^{th} Augustમાં thને કઈ અસર આપવામાં આવેલ છે ? - **Superscript**

265. વેબ બ્રાઉઝર શું છે ? - **સોફ્ટવેર**

266. ઓપરેટિંગ સિસ્ટમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર એ ક્યા પ્રકારના સોફ્ટવેરના ઉદાહરણ છે ? - **સિસ્ટમ સોફ્ટવેર**

267. ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? - **Firewall**

268. કોણ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ? - **WAN**

269. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ? - **2**

270. CPUનું સંપૂર્ણ નામ. - **સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ**

271. ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકુ નામ શું છે ? - **ALU**

272. 1 KB = ... બાઈટ. - **1024**

273. ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું નામ. - **ROM**

274. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપને શુ કહેવાય છે ? - **ક્લોક સ્પીડ**

275. ક્યુ પોઈન્ટિંગ ડિવાઈસ છે ? - **માઉસ**

276. કમ્પ્યૂટરના પ્રિન્ટરની ગુણવત્તા ક્યા આધારે નક્કી કરવામાં આવે છે ? - **દર ચોરસ ઈંચ ઉપરના ડોટ**

277. કમ્પ્યૂટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય છે? - **કન્ટ્રોલ પેનલ**

278. ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું....- **સિસ્ટમ સોફ્ટવેર છે.**

279. વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર ક્યા વિકલ્પમાં જોવા મળે છે ? - **એસેસરીઝ**

280. MS Paintમાં તૈયાર થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ? - **.bmp**

281. નોટપેડમાં નવી ફાઈલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે ? - **Ctrl + N**

282. સ્ક્રીન ક્લીઅર કરવા માટે ક્યો DOS કમાન્ડ વપરાય છે ? - **Cls**

283. વિન્ડોને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે ક્યા બટનનો ઉપયોગ થાય છે ? - **મીનીમાઈઝ**

284. Ms Officeમાં Wordમાં તૈયાર થયેલ ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે ? - **.doc**

285. ફાઈલને Save કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે ? - **Ctrl + S**

286. MS Wordમાં ક્યો શબ્દ merge પ્રક્રિયામાં જોવા મળતો નથી ? - **Data field**

287. Ms Wordમાં પેપર સાઈઝ બદલવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? - **Page Setup**

288. Ms Wordમાં અલગ-અલગ શેપમાં શબ્દો ક્યા ઓપ્શનથી થાય છે ? - **Word Art**

289. Ms Wordમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા કેટલા પ્રકારના ઓરીએન્ટેશન હોય છે ? - **2**

290. MS Wordમાં કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચી શકાય ? - **Ctrl + Home**

291. કમ્પ્યૂટરમાં ફાયરવોલ ક્યા કામસર ઉપયોગમાં લેવામાં આવે છે ? - **સલામતી**

292. MS Wordમાં છેલ્લે કરેલા ફેરફાર દૂર કરવા માટે ક્યો ઓપ્શન ઉપયોગમાં આવે ? - **Undo**

293. MS Wordમાં ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા ક્યા મેનુનો ઉપયોગ થાય ? - **File**

294. MS Wordમાં Find Option ક્યા મેનુમાં છે ? - **Edit**

295. MS Wordમાં લખાણને Bold કરવા માટે શોર્ટકટ કી શું છે ? - **Ctrl + B**

296. MS Excel બીજા ક્યા નામથી ઓળખાય છે ? - **Spreadsheet**

297. MS Excelમાં સેલ (cell) A1 અને A2ની કિંમતનો સરવાળો કરવા ક્યું સૂત્ર વપરાય ? - **= A1 + A2**

298. વર્કબુક એટલે શાનો સમૂહ ? - **વર્કશીટ**

299. MS Excelમાં એક વર્તુળના ઘણા બધા ભાગ દર્શાવતો ક્યો ચાર્ટ દોરી શકાય ? - **પાઈ ચાર્ટ**

300. MS Power Pointમાં સ્લાઈડ શો ચાલુ કરવા ક્યા મેનુનો ઉપયોગ થાય છે ? - **Slide show**

301. નિયમોના સમૂહને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - **પ્રોટોકોલ**

302. નેટવર્કનું નેટવર્ક ક્યા નામથી ઓળખાય છે ? - **ઈન્ટરનેટ**

303. ઈન્ટરનેટની મદદથી થતા ધંધાકીય વહેવારો ક્યા નામથી ઓળખાય છે ? - **e-Commerce**

304. વેબસાઈટના પ્રથમ પેજને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - **Home page**

305. વેબસાઈટના સરનામાને શું કહેવાય છે ? - **URL**

306. E-mailમાં Textની સાથે File પણ મોકલવી હોય તો ક્યું બટન વપરાય છે ? - **એટેચમેન્ટ**

307. GUIનું આખું નામ.. **Graphical User Interface.**

308. કમ્પ્યૂટરમાં ડેટા સંગ્રહ કરવા અંગેનો સૌથી મોટો એકમ ક્યો ? - **ટેરા બાઈટ**

309. ક્યો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે ? - **ઓટો કરેક્ટ**

310. વેબ કંટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? - **HTML**

311. સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા ક્યા મેનુનો ઉપયોગ થાય છે ? - **Insert + Chart**

312. Ctrl, Shift અને Altને ...... **કી કહેવાય છે.- મોડીફાયર**

313. BMPનું પૂરું નામ શું છે ? - **બિટ મેપ પિક્ચર**

314. ક્યો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે ? - **Height And Width**

315. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ? - **Operating System**

316. Notepad ક્યા પ્રકારનું સોફ્ટવેર છે ? - **યુટીલિટી**

317. MS Wordએ.........પ્રોગ્રામ છે. **વર્ડ પ્રોસેસિંગ**

318. કી બોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે ? - **12**

319. રેમ એટલે શું ? - **રેન્ડમ એક્સેસ મેમરી**

320. RAMનો સમાવેશ ક્યા પ્રકારની મેમરી તરીકે થાય છે ? - **પ્રાયમરી મેમરી**

321. વેબપેજને રિફ્રેશ કરવા........કીનો ઉપયોગ થાય છે. - **F5**

322. ક્યુ ચિહ્ન ઈ-મેઈલ આઈ.ડી.ને બે ભાગમાં વહેંચે છે ? - **@**

323. નેટવર્કમાં પ્રસારણ (ટ્રાન્સમીશન) માટે ડેટાના કોડીંગ અને સ્ક્રેમબલીંગને .... કહે છે. - **એન્ક્રિપ્શન**

324. તમારા કમ્પ્યૂટરમાં ઈ-મેલ ડાઉનલોડ કરવા માટે ઈ-મેલ ક્લાયન્ટ દ્વારા વપરાતો પ્રોટોકોલ......... છે. - **POP**

325. MS Wordમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ? - **Alt + F8**

326. DPIનું પૂરું નામ શું છે ? - **Dots Per Inch**

327. BIOSનું પૂરું નામ શું છે ? - **Basic Input Output System**

328. વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કિનો ઉપયોગ કરવામાં આવે છે ? - **F5**

329. નેટવર્કમાં રહેલા કમ્પ્યૂટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ? - **IP એડ્રેસ**

330. જંક ઈમેલને ....પણ કહેવાય છે. - **સ્પામ**

331. DVDનું પૂરુ નામ શું છે ? - **Digital Versatile Disc**

332. Ms Word ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ? - **વર્ડ પ્રોસેસર**

333. કોઈના કમ્પ્યૂટરના પસાવર્ડની ચોરી કરવી એને માટે અંગ્રેજીમાં ક્યો શબ્દ પ્રયોજાય છે ? - **સ્પુફિંગ (Spoofing)**

334. કોમ્પ્યૂટરમાં ROM એટલે શું ? - **Read Only Memory**

335. કમ્પ્યૂટરના સીસ્ટમ સોફ્ટવેરમાં મુખ્યભાગ ક્યો છે ? - **Operating System**

336. ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? - **F2**

337. Outlook Express શું છે ? - **સોફ્ટવેર**

338. MS Wordમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ? - **Alt + F8**

339. Recycle binમાં પડેલ ફાઈલ કે ફોલ્ડર ડીલીટ કરવાથી .... થાય. - **ફાઈલ કે ફોલ્ડર હંમેશને માટે ડીલીટ થઈ જાય છે.**

340. મોડેમનું પૂરું નામ શું છે ? - **મોડ્યુલેટર-ડિમોડ્યુલેટર**

341. .com એક્સ્ટેન્શન એટલે........- **વેબસાઈટ કોમર્શિયલ છે.**

342. સર્વર પરથી ફાઈલ આપણા કમ્પ્યૂટર પર કોપી કરવાની ક્રિયાને ...... કહેવાય. - **ડાઉનલોડિંગ**

343. MS Power Point દસ્તાવેજ ....તરીકે ઓળખાય છે. - **ડોક્યુમેન્ટ**

344. ક્યા પ્રિન્ટરમાં ટોરનો ઉપયોગ થાય ? - **લેસર પ્રિન્ટર**

345. Ms Excelની વર્કશીટમાં દેખાતી ઊભી આડી ગ્રે લાઈનને........ કહે છે. - **ગ્રીડ લાઈન**

346. હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા ક્યા ટુલનો ઉપયોગ થાય છે ? - **Defragment**

347. Software એટલે શું ? - **કોમ્પ્યૂટર પ્રોગ્રામ, ઓપરેટિંગ સિસ્ટમ, આજ્ઞાઓનો સમૂહ**

348. Ms Wordમાં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માંટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે ? - **F4**

349. સામાન્ય રીતે હાઈપરલિંક........કલર ધરાવે છે. - **વાદળી**

350. Jpegનું પૂરું નામ જણાવો. - **Joint photographic experts group**

351. Ms Excelમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે ? - **255**

352. MAC શું છે ? - **Media Access Control**

353. કમ્પ્યૂટર ઓડિયો સીડી સાંભળવા માટે ક્યા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે ? - **વિન્ડોઝ મીડિયા પ્લેયર**

354. સામાન્ય રીતે IP એડ્રેસ......... બીટનું બનેલું હોય છે. - **32**

355. USBનું પૂરું નામ શું છે ? - **Universal Serial Bus**

356. Formula bar .... માં હોય છે. - **Excel**

357. ઈન્ટરનેટ સાથે જોડાણ કરવા માટે કઈ ચાર વસ્તુઓ જરૂરી છે ? - **કમ્પ્યૂટર, ISP, મોડેમ અને કમ્યુનિકેશન સોફ્ટવેર**

358. કયો વિકલ્પ ઈ-મેઈલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે ? - **Outlook Express**

359. કમ્પ્યૂટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે છે ? - **8**

360. MPEG4 વિડિયો ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે ? - **.mp4**

361. પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે ક્યા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ? - **USB**

362. કમ્પ્યૂટરની પોતાની જાણકારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે બીજાના કમ્પ્યૂટરમાંથી માહિતી મેળવનાર કે નુકસાન પહોંચાડનારને શું કહે છે ? - **હેકર**

363. કમ્પ્યૂટર ડેટા સંગ્રહવા માટે અને ગણતરી માટે કઈ નંબર પદ્ધતિનો ઉપયોગ કરે છે ? - **બાયનરી**

364. કમ્પ્યૂટરમાં કાયમી મેમરી હોય છે તેને શું કહે છે ? - **ROM**

365. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે ક્યો પોર્ટ ઉપયોગી બને છે ? : **UPS**

366. MS Wordમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય છે? : **Ctrl + F2**

367. abc@gmail.comમાં gmail શું છે ? : **હોસ્ટ નેમ**

368. કી-બોર્ડમાં Backspace કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે ? : **ડાબી**

369. Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે? : **Shift + F7**

370. MS Power Pointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? **: Slide Show → Hide Slide**

371. ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? : **F2**

372. MS Wordની ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? : **Ctrl + W**

373. MS Wordમાં પેરેગ્રાફને કેટલા પ્રકારનું એલાઈન્મેન્ટ આપી શકાય છે ? : **4**

374. MS Wordમાં ટાઈપિંગ ભૂલ આપમેળે સુધારવા માટે શું ઉપયોગી બને છે? : **Auto Correct**

375. MS Wordમાં પેજને આડું દર્શાવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? : **Landscape**

376. CD બર્ન કરવા માટે ક્યા સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? : **Nero**

377. સામાન્ય રીતે DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ? : **4.7 GB**

378. MS Word ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? : **Ctrl + Home**

379. Maximize કરેલ વિન્ડોમાં Maximize બટનના સ્થાને ક્યું બટન જોવા મળે છે? : **Restore**

380. MS Wordમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારી લેવામાં આવે તે માટે ક્યો વિકલ્પ ઉપયોગી બને છે ? : **Auto Correct**

381. કમ્પ્યૂટર સ્ક્રીન પર દેખાતા પોઈન્ટનું નિયંત્રણ શેના દ્વારા થાય? **: માઉસ**

382. વેબસાઈટના પ્રથમ પેજને ક્યા નામે ઓળખવામાં આવે છે ? - **હોમપેજ**

383. નોરટોન શું છે ? - **એન્ટિવાઈરસ સોફ્ટવેર**

384. Mo Wordમાં પૂર્વનિર્ધારિત રીતે ફાઈલનું નામ શું જોવા મળે છે? - **Document**

385. ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી કઈ જગ્યાએ જાય છે ? - **રીસાઈકલ બિન**

386. વેબ પેઈજ બનાવવા કઈ લેંગ્વેજનો ઉપયોગ થાય છે ? - **હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ (HTML)**

387. કેલ્સીમાં બનવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે ? - **.ods**

388. .org, .gov, .com,.edu વગેરે શું છે ? - **ડોમેઈન નેમ**

389. Ms Wordમાં છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવા ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? - **Undo**

390. ડિજિટલ સિસ્ટમનો સૌથી નાનો એકમ ..... છે. - **બીટ**

ભારતીય અર્થવ્યવસ્થા

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ?
   A) 15 ઓગસ્ટ, 1950 B) 31 માર્ચ, 1950
   C) 26 જાન્યુઆરી, 1950 D) 15 માર્ચ, 1950
2. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો.
   A) Bharat interface of money
   B) bharat interfinancial for money
   C) Bharat Interface for Money
   D) Bharat intraface for Money
3. 1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ?
   A) હૈદરાબાદ B) દિલ્હી C) કલકત્તા D) મુંબઈ

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

4. બેંક લોનના સંદર્ભમાં E.M.I એટલે શું ?
   A) ઈઝી મની ઈન્સ્ટોલમેન્ટ
   B) ઈક્વલ મીનીમમ ઈન્સ્ટોલમેન્ટ
   C) ઈક્વલ મની ઈન્સ્ટોલમેન્ટ
   D) ઈક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

5. ECS નું પૂરું નામ જણાવો.
   A) ઈલેક્ટ્રોનિક કેર સિસ્ટમ B) ઈલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ
   C) ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ
   D) ઈલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ
6. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?
   A) 8મી નવેમ્બર, 2016 B) 31મી ડિસેમ્બર, 2016
   C) 8મી ડિસેમ્બર, 2016 D) 8મી ઓક્ટોબર, 2016
7. ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ?
   A) ચેન્નાઈ B) મુંબઈ C) દિલ્હી D) કોલકાતા

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

8. બેંક ઓફ ઈન્ડિયાનું પ્રતિક શું છે ?
   A) લક્ષ્મીજી B) દીવો
   C) તારો D) ભેગા થતા બે હાથ
9. VATનું પૂરું નામ શું છે ?
   A) Very Attractive Tax B) Validity Added Tax
   C) Value Added Tax D) Value Adjustment Tax

GPSC પેપર - 1 - 2017

10. ભારતમાં દર દશ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?
    A) નાણા મંત્રાલય
    B) આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય
    C) ગૃહ મંત્રાલય D) માનવ સંસાધન મંત્રાલય
11. અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારી શરૂ થઈ હતી?
    A) 1853 B) 1909 C) 1921 D) 1951
12. નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
    A) શંકર આચાર્ય B) અરૂણ જેટલી
    C) હસમુખ અઢિયા D) પી.વી. રાજારામન

GPSC પેપર - 2 - 2017

13. ભારતના ક્યા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ?
    A) પંજાબ B) રાજસ્થાન C) કેરળ D) ગુજરાત
14. 5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?
    A) રેલ સલામતી રીઝર્વ ફંડ B) રેલવે અકસ્માત શમન ફંડ
    C) રેલ સુરક્ષા અર્થ કોશ D) રાષ્ટ્રીય રેલ સંરક્ષા કોશ
15. રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી?
    A) FRBM એક્ટની સમીક્ષા માટે
    B) વિમુદ્રિકરણની અસરોનો અભ્યાસ કરવા માટે
    C) ડિજિટલ ચૂકવણીઓ માટે
    D) ચૂકવણી બેન્કો (પેમેન્ટ બેન્કસ)ને લાઈસન્સ આપવા માટે
16. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના .... ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી.
    A) રેનિસફાઈ B) આર્થર લુઈસ
    C) આર.એફ. હેરોડ D) પી.સી. મહાલનોબિસ
17. કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ?
    A) ચેલૈયાહ સમિતિ B) કેલકર સમિતિ
    C) શોમે સમિતિ D) તેંદુલકર સમિતિ

1)D, 2)C, 3)C, 4)D, 5)C, 6)A, 7)B, 8)C, 9)C, 10)C, 11)C, 12)A, 13)C, 14)D, 15)C, 16)C, 17)B.

18. ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?
A) નરસિંહમ સમિતિ B) વૈદ્યનાથ સમિતિ
C) એમ.એલ. દાંતવાલા સમિતિ D) એ.ડી.ગોરવાલા સમિતિ

19. નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારાં અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?
A) અબિદ હુસૈન સમિતિ B) ભગવતી સમિતિ
C) રાજા ચેલૈયાહ સમિતિ D) નરસિંહમ્ સમિતિ

20. 2017 - 18ના કેન્દ્રિય અંદાજપત્રમાં ઉમેરવામાં આવેલ 'SANKALP' શું છે ?
A) Skill Acquisition and knowledge awareness for livelihood promotion programme
B) Smart city land Acquisition awareness programme
C) Skill Acquisition and knowledge awareness programme for life
D) Small scale knowledge promotion

21. એશિયાનું પ્રથમ શેરબજાર .... છે.
A) નેશનલ શેરબજાર B) શાંઘાઈ શેરબજાર
C) મુંબઈ શેરબજાર D) ટોકિયો શેરબજાર

22. બીટકોઈન (Bitcoin)ની હિમાયત કોણે કરી હતી ?
A) ટી.વિલિયમ્સ B) સાતોશી નાકામોટો
C) બિલ ગેટ્સ D) મહમ્મદ યુનુસ

23. ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?
A) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
B) રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
C) નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
D) ઉપર પૈકી એકપણ નહીં

24. ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ?
A) IMFIG (ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ - ગુજરાત)
B) GIDC (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)
C) GIIC (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન)
D) INDEXT b (ઈન્ડસ્ટ્રીયલ એક્સ્ટેશન બ્યુરો)

25. નીચે આપેલ યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા/ સંસ્થાઓ પસંદ કરો.
A) EXIM બેન્ક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક)
B) NHB (નેશનલ હાઉસિંગ બેન્ક)
C) NABARD (નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ)
D) ઉપરના તમામ

26. નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિર્ટન કોના માટે છે?
A) નોકરિયાત વર્ગ માટે B) વરિષ્ઠ નાગરિકો માટે
C) વેરા ભરનાર સ્ત્રીઓ માટે D) નાના ધંધાર્થીઓ માટે

27. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
A) નીલ ક્રાન્તિ (Blue Revolution) - માછલી અને દરિયાઈ ખોરાક
B) સપ્તરંગી ક્રાન્તિ (Rainbow Revolution) - કૃષિ અને બાગાયત
C) શ્વેત ક્રાન્તિ (White Revolution) - દૂધ અને દૂધની બનાવટો
D) પીળી ક્રાન્તિ (Yellow Revolution) - ફળ અને ફૂલ

28. ભારતમાં ફુગાવાનું માપ શું છે ?
A) જથ્થાબંધભાવાંક (WPI) B) ગ્રાહકભાવાંક (WPI)
C) ઉત્પાદકભાવાંક (WPI) D) ઉપરના પૈકી કોઈ નહીં

29. ત્રીજી પંચવર્ષીય યોજના .... તરીકે પણ ઓળખાય છે.
A) સેન યોજના B) ગાડગીલ યોજના
C) મહેલનોબિસ યોજના D) ઉપરના પૈકી કોઈ નહીં

30. ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?
A) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
B) નાણા મંત્રાલય, ભારત સરકાર
C) વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
D) ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર

31. ક્યા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ?
A) IMF B) UNESCO C) UNDP D) UNICEF

GPSC MAINS પેપર - 1 - 2016

32. ક્યા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ?
A) માળખાકીય બેરોજગારી B) ઘર્ષણયુક્ત બેરોજગારી
C) ચક્રિય બેરોજગારી D) છુપી બેરોજગારી

33. પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે?
A) અસમતોલ અર્થતંત્ર B) પ્રાદેશિક પછાતપણું
C) પ્રાદેશિક અસમતોલતા D) ઉપરના પૈકી એકપણ નહી

34. નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?
A) એસ.ચક્રવર્તી B) પી.સી.મહાલનોબીસ
C) વી.કે.આર.વી.રાવ D) એ.કે.સેન

35. નીચેના પૈકી કઈ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ?
A) સાતમી યોજના B) આઠમી યોજના
C) નવમી યોજના D) દસમી યોજના

36. 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે
A) બાહ્ય ક્ષેત્ર B) વિત્તિય ક્ષેત્ર
C) કૃષિ ક્ષેત્ર D) ઔદ્યોગિક ક્ષેત્ર

18)D, 19)C, 20)A, 21)C, 22)B, 23)B, 24)D, 25)D, 26)D, 27)D, 28)B, 29)B, 30)B, 31)C, 32)D, 33)C, 34)B, 35)C, 36)C.

37. ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?
A)દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
B)ત્રીજી પંચવર્ષીય યોજના પછી
C)ચોથી પંચવર્ષીય યોજના પછી
D)ઉપરના પૈકી એકપણ નહી

38. EPZ એટલે શું ?
A)એક્સપોર્ટ પ્રોડક્શન ઝોન B)એક્સપોર્ટ પ્રમોશન ઝોન
C)એક્સપોર્ટ પ્રોસેસીંગ ઝોન D)એક્સપોર્ટ પેમેન્ટ ઝોન

39. નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં કયા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ?
A)મશીનરી B) ઈલેક્ટ્રોનિક વસ્તુઓ
C)રત્નો અને આભુષણો D) પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચુ તેલ

40. નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?
A)ગુજરાત B)ઓરિસ્સા C)અસમ D)તેલંગાના

41. કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?
A)જોન મીરાન્ડ કેઈન્સ B)એ.સી.પીગુ
C)જગદીશ ભગવતી D)અમર્ત્ય સેન

42. 'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?
A)એડમ સ્મિથ B) એલફ્રેડ માર્શલ
C)સુરેશ ડી. ટેન્ડુલકર D)અમર્ત્ય સેન

43. નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી?
A)પ્રગતિશીલ કરવેરા B)સંપત્તિનું કેન્દ્રીકરણ
C)ફુગાવો D)જમીનની માલિકીમાં અસમાનતા

44. પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ?
A)આઠમી યોજના (1992-97) B) નવમી યોજના (1997-2002)
C) દસમી યોજના (2002-07) D) અગિયારમી યોજના (2007-12)

45. ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ?
A)ઉપભોગ ખર્ચ B) આવક C) સંપત્તિ
D)બેરોજગારી

46. સરકારી વિત્તને શું કહેવાય છે ?
A)રાષ્ટ્રીય વિત્ત B) જાહેર વિત્ત
C) ખાનગી વિત્ત D)ઉપરના પૈકી એકપણ નહી

47. કરવેરાના સિદ્ધાંત/સિદ્ધાંતો.......... છે.
A)સમાનતાનો સિદ્ધાંત B) ચોક્કસતાનો સિદ્ધાંત
C) ખાનગીપણાનો સિદ્ધાંત D)ઉપરના A અને B બન્ને

48. નીચેના પૈકી ક્યો કર વેરો ભરવાની ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?
A)સીગરેટ્સ ઉપરની આબકારી જકાત
B) વ્યક્તિગત આવક વેરો
C)સપ્રમાણ વેચાણ વેરો D)હાઈવે ટોલ ટેક્સ

49. સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?
A)રાજકોષીય નીતિ B)નાણાકીય નીતિ
C) વાણિજ્યિક નીતિ D)વિત્ત નીતિ

50. ક્યા કિસ્સામાં વેરાનો બોજો ખસેડી શકાય ?
A)આડકતરા વેરા B)સીધા વેરા
C)એસ્ટેટ ડ્યુટી (કર) D)સંપત્તિ વેરા

51. નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેંક નથી ?
A)ભારતીય સ્ટેટ બેંક B)બેંક ઓફ બરોડા
C) એક્સીસ બેંક D)ઈન્ડિયન ઓવરસીઝ બેંક

52. ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું?
A)1951 B)1969 C) 1991 D)2009

53. 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.
A)રેપો રેટમાં ઘટાડો B)વ્યાજદરમાં વધારો
C) ગરીબીમાં ઘટાડો D)ભારતીય રૂપિયાનું અવમૂલ્યન

54. નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ?
A)ICRA B) SEBI
C) CRISIL D)ફીચ રેટિંગ્સ (Fitch Ratings)

55. નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા ભેટ-વેરો નાખવામાં આવ્યો ?
A)1953 B)1957 C) 1958 D) 1962

56. ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ?
A)ભારતીય સ્ટેટ બેંક B)બેંક ઓફ બરોડા
C)સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા D)પંજાબ નેશનલ બેંક

57. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી?
A)1947 B)1950 C) 1951 D) 1952

58. નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?
A)સંઘ લોક સેવા આયોગ B)રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
C) રાષ્ટ્રીય વિકાસ પરિષદ D)કેન્દ્રીય તકેદારી આયોગ

59. નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ (Disinvestment Department) સ્થાપવામાં/શરૂ કરવામાં આવ્યું ?
A)1992 B)1993 C) 1999 D)2001

60. ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ?
A)1991 B)1995 C) 1997 D)2001

37)A, 38)C, 39)D, 40)C, 41)D, 42)A, 43)A, 44)D, 45)A, 46)B, 47)D, 48)B, 49)A, 50)A, 51)C, 52)B, 53)D, 54)B, 55)C, 56)A, 57)D, 58)C, 59)C, 60)C.

103. મિશ્ર ખેતી એટલે શું?
A)એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે
B)ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે
C)અનાજ અને કઠોળનું ઉત્પાદન એક સાથે કરવામાં આવે
D)ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે

104. મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના ક્યા ક્ષેત્રમાં સમાવેશ થાય છે?
A)પ્રથમ B)દ્વિતીયક C)તૃતીયક D)ચતુર્થક

105. 'ઈમ્પિરીયલ બેંક ઓફ ઈન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ ક્યા નામથી ઓળખવામાં આવે છે?
A)સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા B)બેંક ઓફ ઈન્ડિયા
C)રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા D)ઈન્ડિયન બેંક

106. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે?
A)રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
B)નીતિ આયોગ (NITI Aayog)
C)ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા (Indian Statistical Institutetion)
D)કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઑફીસ (Central Statistical Office)

107. 'સોનેરી તંતુ ક્રાંતિ' (Golden Fiber Revolution) ક્યા પાક સાથે સંકળાયેલ છે?
A)સૂર્યમુખી B)કપાસનું તંતુ
C)તેલિબિયાં D)શણ

108. ભારતમાં વસ્તીવધારાના ઈતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે?
A)1911 B)1931 C)1921 D)1951

109. નાબાર્ડ (NABARD - National Bank for Agriculture and Rural Development) ની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી?
A)ચોથી પંચવર્ષીય યોજના B)પાંચમી પંચવર્ષીય યોજના
C)છઠ્ઠી પંચવર્ષીય યોજના D)સાતમી પંચવર્ષીય યોજના

110. ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે?
A)રિઝર્વ બેંકના ગવર્નરના B)રાષ્ટ્રપતિના
C)ભારતના નાણામંત્રીના D)નાણામંત્રાલયના સચિવના

111. 'OTCEI' ક્યા દેશના એક સ્ટોક એક્સચેન્જનું નામ છે?
A)અમેરિકા B)ભારત C)બ્રાઝિલ D)ફ્રાંસ

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

112. ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે?
A)ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાન
B)નેશનલ કાઉન્સીલ ઓફ એપ્લાઈડ ઈકોનોમીક રીસર્ચ
C)સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ આર્ગેનાઈઝેશન
D)રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા

GPSC Class - 2 - 12/2/2017

113. "Index of Eight Core Industries" માં સૌથી વધારે મહત્વ ક્યા ઉદ્યોગને આપવામાં આવેલ છે?
A)વિજળીનું ઉત્પાદન B)સિમેન્ટનું ઉત્પાદન
C)ખાતરનું ઉત્પાદન D)કોલસાનું ઉત્પાદન

114. અર્થશાસ્ત્રમાં "FMCG" શબ્દ શાના માટે વાપરવામાં આવે છે?
A)Fast melting consumer goods
B)Fast moving consumer goods
C)Forward marketing for consumer goods
D)Future marketing for costly goods

115. નીચેના પૈકી કોણે RBI ના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.
A)શ્રી સી.ડી.દેશમુખ B)ડૉ.આઈ.જી.પટેલ
C)ડૉ.મનમોહન સિંહ D)શ્રી.આનંદ સીન્હા

116. 'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે?
A)રાજ્યની સહકારી બેન્કો
B)રીજીયોનલ રૂરલ બેન્કો
C)કમર્શિઅલ બેન્ક (વાણિજ્ય બેન્ક)
D)ઉપરોક્ત બધી જ સંસ્થાઓ

GPSC Class - 2 - 28/1/2017

117. દૂધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી?
A)White Revolution B)Yellow Revolution
C)Blue Revolution D)Pink Revolution

118. 14માં નાણાપંચની ભલામણો કયા વર્ષ માટે લાગુ પાડવામાં આવશે.
A)2005 થી 2010 B)2010 થી 2015
C)2015 થી 2020 D)2020 થી 2025

119. "નીતિ આયોગ" ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતુ નથી?
A)લોક સેવા આયોગ B)નાણાપંચ
C)પ્લાનીંગ કમિશન D)ભારતનું ચૂંટણી પંચ

120. નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં 'GDP' (Gross Domestic Product) ની ગણતરી અને જાહેરાત કરે છે?
A)RBI (Reserve Bank of India)
B)નાણામંત્રી મંત્રાલય
C)નીતિ આયોગ
D)CSO - Central Statistical Office

103)B, 104)A, 105)A, 106)D, 107)D, 108)C, 109)C, 110)D, 111)B, 112)C, 113)A, 114)B, 115)D, 116)D, 117)A, 118)C, 119)C, 120)D.

GPSC Class-1 - 15/01/2017

121. રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે?
A) અંદાજપત્રીય ખાધ B) પ્રાથમિક ખાધ
C) અસરકારક મહેસુલી ખાધ D) મહેસૂલી ખાધ

122. ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક (Architect of Blue Revolution) કોણ ગણાય છે?
A) એમ.એસ.સ્વામીનાથન B) હિરાલાલ ચૌધરી
C) વર્ગીસ કુરિયન D) શામળભાઈ ખારવા

123. "ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધીત છે?
A) ગરીબી રેખાનું નિર્ધારણ B) નાણાકીય ખાધનું નિર્ધારણ
C) રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેંચણી
D) રીઝર્વ બેંક દ્વારા બેન્કીંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા

124. અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફ્લેશન' (Stagflation) છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે?
A) ખૂબ જ ઊંચા દરે ફુગાવો
B) ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
C) ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
D) નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી

125. માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી?
A) અપેક્ષિત આયુષ્ય B) શિક્ષણ
C) બાળમૃત્યુ D) માથાદીઠ આવક

126. "સોચ કર, સમજ કર ઈન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે?
A) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા B) સેબી (SEBI)
C) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ D) બિરલા સનલાઈફ મ્યુચ્યલ ફંડ

GPSC Class-1 - 15/01/2017

127. TRIFEDની રચના ક્યારે થઈ હતી ?
A) 1985 B) 1986 C) 1987 D) 1988

128. પંચવર્ષીય યોજનાઓ .... થી શરૂ કરવામાં આવી.
A) 1952 B) 1951 C) 1953 D) 1955

GPSC Class-1 - 15/01/2017

129. HDI એટલે.......
A) હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ B) હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ
C) હ્યુમન ડીસીઝ ઈન્ડેક્ષ D) હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ટગ્રેશન

130. સમગ્ર ભારતમાં census - વસ્તી ગણતરી ક્યારે થાય છે?
A) દરેક વર્ષે B) જરૂર મુજબ C) દર દશ વર્ષે D) દર પાંચ વર્ષે

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

131. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગર્વનરની નિમણૂંક ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?
A) પાર્લામેન્ટ એક્ટ B) રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા એક્ટ
C) ફીસકલ પોલીસી એક્ટ D) આયોજન પંચ

132. દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ?
A) નાણા ખાતું B) રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા
C) આયોજન પંચ D) સંસદ

133. દેશમા "એક્ઝિમ નીતિ" આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ?
A) 1 વર્ષ B) 3 વર્ષ C) 5 વર્ષ D) 10 વર્ષ

134. નીચેના પૈકી કયુ GST કાઉન્સિલ બાબતે સાચું છે ?
A) વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે.
B) GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બન્નેને ભલામણો કરશે.
C) (A) અને (B) બન્ને
D) ઉપરના પૈકી કોઈ નહી

135. ડીજીટલ ચૂકવણાં ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો છે ?
A) એચ.આર.ખાન સમિતિ B) રતન વાતલ સમિતિ
C) ઈન્દ્રજીત શેખર સમિતિ D) સલિલ કપુર સમિતિ

136. ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો કયાં હતાં ?
A) 1953, 1976 અને 2016 B) 1954, 1978 અને 2016
C) 1956, 1975 અને 2016 D) 1957, 1974 અને 2016

137. ભારતમાં મત્સ્યઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે ?
A) લાલક્રાન્તિ B) જળક્રાન્તિ C) નીલક્રાન્તિ D) મત્સ્યદન

GPSC Class - 2 - 16/04/2017

138. દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે?
A) પંજાબ નેશનલ બેંક B) નાબાર્ડ
C) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા D) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

139. 'ક્લોઝ ઈકોનોમી' (Closed Economy) એટલે શું?
A) દેશમાંથી માત્ર નિકાસ થાય છે.
B) દેશમાંથી માત્ર આયાત થાય છે.
C) દેશમાંથી આયાત / નિકાસ થાય છે.
D) દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.

140. નીચેના પૈકી કઈ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડીટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી?
A) વાણિજ્ય બેંકો B) નાબાર્ડ
C) સહકારી બેંકો D) ગ્રામીણ બેંકો

121)B, 122)B, 123)C, 124)C, 125)C, 126)B, 127)C, 128)B, 129)A, 130)C, 131)B, 132)B, 133)C, 134)B, 135)B, 136)B, 137)C, 138)D, 139)D, 140)B.

141. સ્વફીટ કોડ "(SWIFT CODE)' કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે?
A)સીબીલ (CIBIL)　B) બેન્ક
C) શેરબજાર　D) ક્રેડીટ કાર્ડ કંપનીઓ

142. બુલ (Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?
A) નીતિ આયોગ　B) શેર બજાર
C) વેચાણ વેરા વિભાગ　D) આવક વેરા વિભાગ

143. " IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે?
A) બેન્કીંગ ક્ષેત્રે　B) શેર બજારના વ્યવહારો
C) ગ્રામ વિકાસ　D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

144. નીચેનામાંથી ક્યો પરોક્ષ કર નથી ?
A)સેવા કર　B) કોર્પોરેટ ટેક્સ
C) સીમ શુલ્ક (કસ્ટમ ડ્યુટી) D) વેલ્યુ એડેડ ટેક્ષ (VAT)

145. નીચેનામાંથી ક્યો પ્રત્યક્ષ કર નથી ?
A)સંપત્તિ વેરો　B) કોર્પોરેટ ટેક્ષ
C) સિક્યોરીટી ટ્રાન્ઝેકશન ટેક્સ D) આબકારી જકાત

146. "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય.
A) કૃષિ અને ઉદ્યોગો એમ બન્નેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર
B) ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર
C) નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર
D) ઉપર્યુક્ત એક પણ નહીં

147. મહામંદી કોને કહેવાય ?
A) સતત છ માસ સુધી મંદી રહે તેને
B) સતત એક વર્ષ સુધી મંદી રહે તેને
C) સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
D) સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને

148. વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક (Benchmark Index) પૈકી કઈ જોડ ખોટી છે ?
A) યુરોનેક્સ્ટ - પેરિસ - CAC 40
B) બેજિંગ સ્ટોક એક્સચેન્જ - Hang seng Index
C) ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ - DAX
D) નેશનલ સ્ટોક એક્સચેન્જ - Nifty 50

149. નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે ?
A) તા.1-1-2015　B) તા.1-5-2015
C) તા.1-6-2015　D) તા.1-4-2015

150. 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ?
A) પાંચમી　B) સાતમી　C) છઠ્ઠી　D) ચોથી

151. શ્રી દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી ?
A) 2012　B) 2014　C) 2013　D) 2015

152. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
A) માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા B) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
C) સંસદ દ્વારા　D) નાણા મંત્રાલય દ્વારા

153. કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?
A) ભાવ વધે　B) ભાવ ઘટે
C) ભાવ યથાવત રહે　D) ઉપરની કોઈપણ બાબત બન્ને

154. VAT એટલે શું ?
A) Value and Tex　B) Value Added Tax
C) Virtual Action Tasks　D) Virtual Assessment Technique

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

155. ટેકનોલોજીના ઉપયોગના કારણે થયેલ ક્રાંતિઓને યોગ્ય રીતે ગોઠવો.
1) હરિયાળી ક્રાંતિ　A) તેલીબિયા, ખાદ્યતેલ
2) શ્વેત ક્રાંતિ　B) અન્ન ક્ષેત્ર
3) ભૂરી ક્રાંતિ　C) દૂધ અને દૂધ પેદાશ
4) પીળી ક્રાંતિ　D) દરિયાઈ પેદાશ
A) 1-C, 2-D, 3-A, 4-B　B) 1-B, 2-C, 3-D, 4-A
C) 1-D, 2-A, 3-B, 4-C　D) 1-A, 2-B, 3-C, 4-D

156. પ્રોફેસર અમર્ત્ય સેન ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
A) જૈવ રસાયણશાસ્ત્ર　B) ઈલેક્ટ્રોનિક્સ
C) અર્થશાસ્ત્ર　D) ભૂસ્તરશાસ્ત્ર

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

157. પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે?
A) FII　B) FDI
C) (A) અને (B) બન્ને　D) ઉપરના પૈકી કોઈ નહીં

158. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે?
A) ધન　B) વ્યસ્ત　C) સપ્રમાણ　D) શૂન્ય

159. ભારતમાં ક્યા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ?
A) વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી
B) સંકલિત ગ્રામિણ વિકાસ કાર્યક્રમથી
C) Lead Bank (મુખ્ય બેંક) સ્કીમ થી
D) ઉપરના પૈકી કોઈ નહીં

141)B, 142)B, 143)D, 144)B, 145)D, 146)B, 147)C, 148)B, 149)A, 150)C, 151)B, 152)A, 153)D, 154)B, 155)B, 156)C, 157)B, 158)B, 159)A.

160. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે?
A)ચક્રિય B)માળખાગત C)નિરપેક્ષ D)સાપેક્ષ

161. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય?
A)ખાનગીકરણ B)ઉદારીકરણ
C)આયાત અવેજીકરણ D)વૈશ્વિકીકરણ

162. શ્રમપ્રધાન ઉત્પાદન-પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિધ્ધાંત અપનાવવાનું કહ્યું છે?
A)દરેક વ્યક્તિને કામ B)દરેક વ્યક્તિને અનાજ
C)દરેક વ્યક્તિને ન્યાય D)દરેક વ્યક્તિને મકાન

163. ટ્રસ્ટીશીપ (વાલીપણા)નો સિધ્ધાંત કોણે રજુ કર્યો?
A)કૌટીલ્ય B)પંડીત દીનદયાળ
C)ગાંધીજી D)કેઈન્સ

164. ચેક ઉપર જોવા MICR Code મળતાં નું આખું સ્વરૂપ કયું છે?
A)Micro ink character recognition
B)Magnetic ink credit registration
C)Magnetic ink character recognition
D)Micro ink credit registration

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

165. બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહ રચના સાથે કોનું નામ સંકળાયેલ છે?
A)એમ.એસ. સ્વામીનાથન B)પી.સી.મહાલાનો બિસ
C)હેરોડ-ડોમર D)રાજકૃષ્ન

166. નીચેના પૈકી કયાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય.રૂપિયાનું અવમૂલ્યન કર્યુ હતું?
A)1966 અને 1991 B)1980 અને 1992
C)1995 અને 2000 D)1978 અને 2016

167. " હિંદુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?
A)પી.સી.મહાલાનોબિસ B)રાજકૃષ્ણ
C)એમ.એસ.સ્વામીનાથન D)એમ.એસ.આહ્લુવાલીયા

168. કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ.........છે.
A)મહેસૂલી ખર્ચ B)મૂડી ખર્ચ
C)ગ્રાંટ પાછળનો ખર્ચ D)ઉપરના પૈકી કોઈ નહીં

169. નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે?
1) સેન્ટ્રલ એક્સાઈઝ 2) વ્યાવસાયિક વેરો
3) સર્વિસ ટેક્સ 4) વેટ
A)ફક્ત 1 અને 2 B)ફકત 3 અને 4
C)ફક્ત 1, 3 અને 4 D)1, 2, 3, અને 4

170. FEMA નું આખું સ્વરૂપ શું છે?
A)Free Exchange of Money Assets
B)Foreign Exchange Money Act
C)Free Exchange Money Assets
D)Foreign Exchange Management Act

GPSC Class - 2 - 18/03/2017

171. નીચેના પૈકી કયા શહેરમાં ઈલેક્ટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે?
A)મુંબઈ B)પુણે C)બેંગલુરૂ D)ગુરૂગ્રામ

172. ઈકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?
A)ચીફ ઈકોનોમિક એડવાઈઝર, નાણા મંત્રાલય
B)ગવર્નર
C)ચેરમેન નાબાર્ડ D)ચેરમેન સેબી

GPSC Class - 1 - 28/01/2017

173. ભારતમાં રાસાણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજયમાં સ્થાપિત કરવામાં આવેલ હતું?
A)ગુજરાત B)પંજાબ C)તામિલનાડુ D)ઉત્તરપ્રદેશ

174. નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું?
A)બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
B)રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
C)વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
D)સેલમ પોલાદ કેન્દ્ર - તામિલનાડુ

175. GST લાગુ થયા પહેલા સર્વિસચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ?
A)14.5% B)15% C)13.5% D)12%

176. ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કયા વર્ષથી થઈ?
A)1951 B)1961 C)1991 D)2002

177. બ્રિક્સબેંકના પ્રથમ વડા કયા દેશના છે?
A)ચીન B)બ્રાઝિલ C)ભારત D)રશિયા

નાયબ ચિટનીશ - 02/06/2015

178. 'નીતિ' (NITI) આયોગના અધ્યક્ષ........છે.
A)અમિત શાહ B)પ્રણવ મુખરજી
C)નરેન્દ્ર મોદી D)અરવિંદ પનગઢીયા

179. દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજય પ્રથમ છે?
A)મહારાષ્ટ્ર B)ગોવા C)ગુજરાત D)દિલ્હી

નાયબ ચિટનીશ - 05/02/2017

180. "યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.
A)રિઝર્વ બેંક B)સ્ટેટ બેંક
C)પ્રસાર ભારતી D)ભારતીય જીવન વીમા નિગમ

160)B, 161)C, 162)A, 163)C, 164)C, 165)B, 166)A, 167)B, 168)A, 169)C, 170)D, 171)C, 172)A, 173)C, 174)A, 175)B, 176)C, 177)C, 178)C, 179)B, 180)D.

181. રૂપિયાની ખરીદ શકિત ઘટવાનું મુખ્ય કારણ જણાવો.
A) ભાવ વધારો B) માંગ વધારો
C) ભાવ ઘટાડો D) વસ્તી વધારો

GPSC Class - 2 - 16/04/2017

182. નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી?
A) ચલણી નાણું બહાર પાડવું
B) વિદેશી હુંડિયામણની જાળવણી કરવાનું
C) કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું
D) માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું

183. હાલમાં ચર્ચામાં રહેલ "MSME" કઈ બાબત સાથે સંકળાયેલ છે?
A) મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઈઝ
B) મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઈઝ
C) માયક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ
D) મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ

184. હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે?
A) શ્રી એ.કે.સેન
B) શ્રી એમ.એસ.આહલુવાલીયા
C) શ્રી એમ.એસ.સ્વામીનાથન
D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

185. તાજેતરમાં " સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા"માં કેટલી બેંકોને ભેળવવામાં ઓવલી છે?
A) 4 B) 5 C) 6 D) 7

GPSC Class - 2 - 02/04/2017

186. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દેશમાં કાચો તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના.....માં કરવામાં આવી હતી.
A) ઈ.સ.1958 B) ઈ.સ.1957 C) ઈ.સ.1959 D) ઈ.સ.1960

187. જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?
A) સરકારી અર્થતંત્ર B) સમાજવાદી અર્થતંત્ર
C) જાહેર અર્થતંત્ર D) જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર

188. આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?
A) આયાત-નિકાસ સરવૈયું B) ચૂકવણી સમતુલા
C) ચૂકવણી સરવૈયું D) ઉપરપૈકી એકપણ નહી

189. ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?
A) જમીન અને સમુદ્ર દ્વારા B) જમીન અને હવાઈ માર્ગ દ્વારા
C) સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા D) સમુદ્ર દ્વારા

190. નાણાકીય નીતિની દ્વિમાસીક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?
A) નાણાપંચ
B) ભારત સરકારનું નાણા મંત્રાલય
C) અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો
D) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

191. NRE Accountમાં E શાને અભિપ્રેત છે ?
A) Essential B) External C) Employee D) Execlusive

192. કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ?
A) એપ્રિલ 2012 B) એપ્રિલ 2011
C) એપ્રિલ 2015 D) એપ્રિલ 2010

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

193. વસ્તીગણત્રી-2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ?
A) 7 B) 10 C) 14 D) 15

194. વસ્તીગણતરી-2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે?
A) 8.9 % નો વધારો B) 7.9 % નો વધારો
C) 8.2 % નો વધારો D) 7.2 % નો વધારો

195. 2001-2011 દાયકા દરમિયાન વસ્તીના સંદર્ભે નોંધાયેલ વિવિધ ફેરફાર યોગ્ય રીતે જોડો.

1) ભારતનો વસ્તી વૃદ્ધિદર	(અ) 19.3 %
2) ગુજરાતનો વસ્તી વૃદ્ધિદર	(બ) 9.3 %
3) ગુજરાતમાં ગ્રામીણ વસ્તી વૃદ્ધિદર	(ક) 36 %
4) ગુજરાતમાં શહેરી વસ્તી વૃદ્ધિદર	(ડ) 17.7 %

A) 1-ક, 2-અ, 3-બ, 4-ક B) 1-ક, 2-ડ, 3-બ, 4-અ
C) 1-ડ, 2-બ, 3-ક, 4-અ D) 1-ક, 2-અ, 3-ડ, 4-બ

195. વસ્તી ગણત્રી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ?
A) 5.2 %નો ઘટાડો B) 5.2 %નો વધારો
C) 4.2 %નો વધારો D) 4.2 %નો ઘટાડો

196. નીચેના પૈકી કયો કર/વેરો "પ્રગતિશીલ કર" (Progressive Tax) છે ?
A) આવકવેરો B) કસ્ટમ કર
C) વેચાણવેરો D) આબકારી કર

GPSC Class - 2 - 12/02/2017

197. "ઝીરો બેઈઝડ" બજેટનો ભારતમાં સૌ પ્રથમ ક્યારે અમલ કરવામાં આવેલ હતો?
A) 1947 B) 1983 C) 1976 D) 1991

181)A, 182)C, 183)C, 184)C, 185)C, 186)C, 187)B, 188)B, 189)C, 190)D, 191)B, 192)A, 193)D, 194)A, 195)A, 196)A, 197)B.

198. આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યકિતને અનુક્રમે કેટલા કેલરી ન્યુનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

A) 2400, 2100　B) 2300, 2000
C) 2000, 1800　D) 2000, 1900

199. ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/-ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે?

A) રૂપિયા 3.09 પૈસા　B) રૂપિયા 3.54 પૈસા
C) રૂપિયા 3.50 પૈસા　D) રૂપિયા 3.48 પૈસા

GPSC Class - 1 - 09/04/2017

200. નીચે દર્શાવેલ ક્યા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

A) ન્યૂ દિલ્હી　B) સિલીગુરી　C) મથુરા　D) સિમલા

201. ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય છે, તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ?

A) ખાતાનો પ્રકાર　B) ધંધાનો પ્રકાર
C) બેંકની શાખાનું નામ　D) બેંકનું નામ

202. ધી સ્પેશ્યલ ઈકોનોમીકસ ઝોન્સ એક્ટ ક્યા વર્ષમાં અમલમાં આવેલ છે.

A) ઈ.સ. 2005　B) ઈ.સ. 2006　C) ઈ.સ. 2007　D) ઈ.સ 2008

203. ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ?

A) રૂ. 500 કરોડ　B) રૂ. 1000 કરોડ
C) રૂ. 1500 કરોડ　D) રૂ. 700 કરોડ

GPSC Class - 2 - 04/03/2017

204. ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઈ હતી ?

A) પહેલી　B) બીજી　C) ત્રીજી　D) ચોથી

205. કઈ પંચવર્ષીય યોજના તેની અવધિ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી ?

A) સાતમી　B) પાંચમી　C) આઠમી　D) છઠ્ઠી

206. સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનીંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

A) 15 માર્ચ 1950　B) 1 માર્ચ 1950
C) 15 ફેબ્રુઆરી 1950　D) 30 માર્ચ 1950

207. વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે ....વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસરાતી પદ્ધતિનો અંત આવેલ છે.

A) 92　B) 95　C) 94　D) 97

GPSC Class - 2 - 18/03/2017

208. નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

A) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.
B) નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
C) સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ.
D) ભારત ઈલેકટ્રીકલ્સ લિ.

209. નીચે પૈકી ક્યુ વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક (Regional Rural Bank) માટે સાચું નથી ?

A) સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.
B) ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
C) ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.
D) ઉપરોક્ત બધા વિધાનો સાચા છે.

210. નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેંક દ્વારા નીચે પૈકી ક્યા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

A) રેપો રેટ　B) રિવર્સ રેપો રેટ
C) કેશ રિઝર્વ રેશિયો　D) રેપો અને રિવર્સ રેપો રેટ બન્ને

211. નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી-રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

A) એસ. આર. હાશીમ સમિતિ　B) લાકડાવાલા સમિતિ
C) વાય. કે. અલઘ સમિતિ　D) એન.સી. સકસેના સમિતિ

212. ડોલેક્ષ - DOLLEX શું છે ?

A) યુ.એસ.એ.નું એક સ્ટોક એક્સચેન્જ
B) ભારતનું એક સ્ટોક એક્સચેન્જ
C) ભારતના નાણાબજારનો એક સૂચકાંક
D) યુ.એસ.એ.ના નાણા બજારનો એક સૂચકાંક

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર કલાસ - 2 (25/2/2017)

213. ભારતમાં ખનિજતેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે ?

A) 55 %　B) 60 %　C) 63 %　D) 52 %

214. મૂલ્ય આધારિત કર (Value added Tax (VAT))ની પદ્ધતિ સૌપ્રથમ ક્યા દેશમાં દાખલ કરવામાં આવી હતી ?

A) ઈટાલી　B) ફ્રાન્સ　C) જર્મની　D) ભારત

215. ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે ક્યા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

A) એડન સ્મિથ　B) કેયન્સ　C) પીગોન　D) અમર્ત્ય સેન

216. પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

A) પ્રત્યેક વર્ષે　B) દર બે વર્ષે
C) પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
D) પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં

198)A, 199)B, 200)B, 201)C, 202)A, 203)B, 204)B, 205)B, 206)A, 207)A, 208)D, 209)C, 210)D, 211)A, 212)C, 213)C, 214)B, 215)D, 216)D.

217. ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી અપનાવવામાં આવેલ?
A)એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન
B)ગોરવાલા રિપોર્ટ
C)ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ
D)ઉપર પૈકી એકપણ નહીં

218. ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?
A)આર.બી.આઈ.ના ગવર્નર B) નાણાં મંત્રાલયના સચિવ
C) કેબિનેટ સચિવ D)લોકસભાના સ્પીકર

219. અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?
A)જાહેર સાહસોની સમિતિ B) જાહેર હિસાબ સમિતિ
C) અંદાજ સમિતિ D)સંરક્ષણ બાબતોની સમિતિ

220. નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાના સંદર્ભમાં ક્યો વિકલ્પ સાચો નથી ?
A)દ્વિતીય પંચવર્ષીય યોજના -1956-1961
B)ચોથી પંચવર્ષીય યોજના -1969-1974
C)આઠમી પંચવર્ષીય યોજના -1990-1995
D)અગિયારમી પંચવર્ષીય યોજના -2007-2012

221. નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્ય દીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ?
A)આઠમી B)સાતમી C)નવમી D)દસમી

222. નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?
A)પ્રથમ B)ત્રીજી C)સાતમી D)પાંચમી

223. ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?
A)જવાહરલાલ નેહરુ B)લાલબહાદુર શાસ્રી
C)આર.કે.ષણમુગમ શેટ્ટી D)ડૉ.જોન મથાઈ

224. POS સ્વાઈપ મશીન કે જેની કેશ લેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POS નું પૂરું નામ શું છે ?
A)પરમેનન્ટ ઓપ્શન સિસ્ટમ B) પોઈન્ટ ઓફ સેલ
C)પોઈન્ટ ઓફ સેવીંગ D)પી ઓરિએન્ટેડ સિસ્ટમ

225. નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમીલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?
A)એમ.કે.લોઢા સમિતિ B)સરદાર સર્વાંગસિંહ સમિતિ
C)રામનંદન સમિતિ D)બળવંતરાય મહેતા સમિતિ

GPSC Class - 2 - 5/3/2017

226. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?
A)આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
B)સમાજવાદી સમાજ રચના
C)જમીન સુધારણા D)આર્થિક સુધારાઓ

227. નીચેના પૈકી કઈ સંસ્થા ખાસ પ્રકારના ધિરાણ કરવા માટે સ્થાપવામાં આવેલ નથી ?
A)IFCI B)NABARD C) NHB D)ICICI

228. OMO, CRR, SLR, CAR, PLR જેવા શબ્દો ક્યા ક્ષેત્રમાં વધારે વપરાય છે ?
A)સંરક્ષણ ક્ષેત્ર B)દુરસંચાર ક્ષેત્ર
C)શિક્ષણ ક્ષેત્ર D)બેન્કીંગ ક્ષેત્ર

229. નીચેના પૈકી કઈ સંસ્થા મહારત્ન-PSC છે ?
A)BHEL B) SAIL
C)GAIL D)ઉપરોક્ત બધીજ સંસ્થાઓ

230. જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે
A)બજારમાં તરલતા (Liquidity) વધે છે.
B)બજારમાં તરલતા (Liquidity) ઘટે છે.
C)તરલતા ઉપર કોઈ અસર થતી નથી.
D)લોકો બેંકોમાં વધારે ડિપોઝીટ મુકે છે.

231. હાલમાં નિતી આયોગમાં કેટલા પૂર્ણ સમયના સભ્યશ્રીઓ છે ?
A)પાંચ B)ચાર C)ત્રણ D)બે
(હાલમાં ચાર થઈ ગયા)

232. હાલમાં "NPA" અંગેની જે ચર્ચાઓ ચાલે છે તેમા 'NPA' નો શું અર્થ છે ?
A)ચોખ્ખી પરફોર્મિંગ - એસેટ / મિલકત
B)નોન-પરફોર્મિંગ એસેટ / મિલકત
C)નવી-પરફોર્મિંગ એસેટ / મિલકત
D)પછીની પરફોર્મિંગ એસેટ / મિલકત

233. ગ્લોબલ હંગર ઈંડેક્સ (GHI)ની ગણત્રીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો
A)1, 2 અને 3 B)2, 3, 4 અને 5
C)1, 2, 3 અને 4 D)1, 2, 3, 4, અને 5

234. નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડીટ રેટીંગ એજન્સીમાં સમાવેશ થાય છે ?
1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર (SAP)
2. મુડીઝ (Moody's) 3. ફીચ ગ્રુપ (Fitch group)
4. કેર રેટીંગ (CARE rating)
A)4, 1 અને 2 B)4, 1 અને 3
C)1, 2 અને 3 D)2, 3 અને 4

217)A, 218)B, 219)C, 220)C, 221)D, 222)C, 223)A, 224)B, 225)C, 226)D, 227)D, 228)D, 229)D, 230)B, 231)C, 232)B, 233)A, 234)C.

GPSC Class - 2 - 11/12/2016

235. ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ?
A)મહારાષ્ટ્ર B)કેરાલા C)ગુજરાત D)તમિલનાડુ

GPSC Class - 2 - 05/02/2017

236. ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂઆત કરી હતી?
A)યશવંતસિંહ B)મનમોહનસિંહ
C)જશવંતસિંહ D)ઉપરના બધા જ

237. બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું?
A)ઉપભોગતા વસ્તુઓ (Consumer Goods)
B)ઉત્પાદક માલ (Capital Goods)
C)મૂળભૂત વસ્તુઓ (Basic Goods)
D)ઉપર (A) અને (B) બંને

238. ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો વધુ હિસ્સો છે?
A)કસ્ટમ ડ્યુટીઝ B)એકસાઈઝ ડ્યુટીઝ
C)ઈન્કમટેક્ષ D)વેલ્થટેક્ષ

239. Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે?
A)Oikenomos B) Ecology C)Phileo
D)Nomos

240. આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું?
A)રાજસ્થાન B)કેરાલા C)ગુજરાત D)પંજાબ

241. રાજવિત્તીય અને ચૂકવણાની સમતુલાની કટોકટીના સંદર્ભમાં ભારત સરકારે કયા વર્ષમાં નવી આર્થિક નીતિની શરૂઆત કરી?
A)1969 B)1980 C)2001 D)1991

242. ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે?
A)ચાર B)ત્રણ
C)બે D)ઉપર પૈકી એક પણ નહી

243. ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેકચરીંગ કોમ્પીટીટીવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે?
A)લઘુ ઉદ્યોગો B)મોટા ઉદ્યોગો
C)લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો
D)મધ્યમ કક્ષાના ઉદ્યોગો

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

244. ભારત વિશ્વવ્યાપાર સંસ્થા (World Trade Organization) નું સભ્ય કયા વર્ષમાં બન્યું?
A)ઈ.સ.1995 B)ઈ.સ.1991 C)ઈ.સ.1990 D)ઈ.સ.1993

245. બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ?
A)વીજળી અને વાહનવ્યહાર B)ભારે ઉદ્યોગો
C)સિંચાઈ D)ગરીબી નાબૂદી

246. "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું?
A)નવમી B)અગિયારમી C)દસમી D)બારમી

247. પ્રસ્તાવિત ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની કુલ જમા રાશિ કેટલી છે?
A)500 કરોડ B)300 કરોડ C)800 કરોડ D)400 કરોડ

248. વર્ષ 2016 માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજયમાં શરૂઆત કરવામાં આવી?
A)તમિલનાડુ B)મહારાષ્ટ્ર
C)કેરળ D)પશ્ચિમ બંગાળ

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

249. કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું હતું?
A)1972 B)1963 C)1957 D)એકેય નહીં

250. કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ?
A)Nation Aid Bank for Agriculture Department
B)National Bank for Rural Development
C)National Bank for Agriculture and Rural Development
D)એકેય નહીં

251. ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષિય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ?
A)1950 B)1952 C)1951 D)એકેય નહીં

252. ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રીઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ હતી ?
A)1 જાન્યુઆરી 1945 B)1 એપ્રિલ 1935
C)1 જાન્યુઆરી 1949 D)એકેય નહીં

253. કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ?
A)10 ટકા B)8 ટકા C)4 ટકા D)6 ટકા

254. વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા જુથે લીધો છે?
A)સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
B)ગરીબી રેખા નીચે જીવતા લોકો
C)ખેડૂત D)સ્થાનિક વેપારીઓ

255. ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષિય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?
A)બીજી પંચવર્ષિય યોજના B)ત્રીજી પંચવર્ષિય યોજના
C)ચોથી પંચવર્ષિય યોજના D)પાંચમી પંચવર્ષિય યોજના

235)B, 236)B, 237)D, 238)D, 239)A, 240)C, 241)D, 242)C, 243)C, 244)A, 245)B, 246)D, 247)C, 248)A, 249)A, 250)C, 251)C, 252)B, 253)C, 254)A, 255)C.

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

256. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ?
A) અરુણ જેટલી B) તીરથસિંહ ઠાકુર
C) એ.કે.માથુર D) બાલચંદ્ર નેમાડે

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

257. આવેકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો?
A)લોર્ડ ડેલહાઉસી B)લોર્ડ રિપન
C)ચાર્લ્સ વૂડ D) જેમ્સ વિલ્સન

258. વર્ષ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ....વર્ષમાં છ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ.
A) 1970 B) 1980 C) 1975 D) 1976

259. ભારતની કઈ પંચવર્ષીય યોજના પ્રો.પી.સી. મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી?
A) પહેલી B)બીજી C) ત્રીજી D) પાંચમી

260. નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરાશે?
A)ટ્રેડ એક્ષપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS)
B)ટ્રેડ એક્ષપોર્ટ સ્કીમ (TES)
C)ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્ષપોર્ટ સ્કીમ (TIES)
D)ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS)

261. કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયાં છે તેને ટૂંકમાં "RAPID'કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે?
A) Probity B) Direct Tax C) Real D) Accountable

262. અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોની હોય તેવા અર્થતંત્રને શું કહેવાય?
A)ખાનગી અર્થતંત્ર B)સામ્યવાદી અર્થતંત્ર
C)બંધ અર્થતંત્ર D)મૂડીવાદી અર્થતંત્ર

263. નીચે પૈકી કયું ગામ ભારતનું પ્રથમ "ડીજીટલ ગામ" બન્યું?
A)ધજ B)આકોદરા C) ચારણકા D)બારડોલી

મુખ્ય સેવિકા - 8/1/2017

264. ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે ?
A) NSS B) CII C) CSO D) SEBI

વિસ્તણ અધિકારી - 7/1/2017

265. ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?
A) પ્રાથમિક સેવા સહકારી મંડળી B) ગ્રામ પંચાયત
C) જિલ્લા ખેતીવાડી અધિકારી D) ગ્રામસેવક

266. સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?
A) ફડચામાં લઈ જવાનું B) સરકાર હસ્તક લેવાનું
C) મંડળીને દંડ કરવાનું D) એક પણ નહીં

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

267. ડિઝિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે?
A)સ્ટેટ બેંક ઓફ
B)રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
C)પંજાબ નેશનલ બેંક
D)નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

268. ડિઝિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લીકેશન માટે કયું વિધા ન/વિધાનો સત્ય છે?
A)તેમાં ઈન્ટરનેટની જરૂર નથી.
B)તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી
C)અહીં દર્શાવેલ ત્રણેય
D)તેમાં સ્માર્ટફોનની જરૂર નથી

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

269. ગુડઝ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ?
A) 8-9-2014 B) 8-9-2016 C) 8-2-2017 D) 15-8-2016

270. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)એ કેવા પ્રકારનો વેરો છે ?
A)સીધા કરવેરા B)આડકતરા કરવેરા
C) A અને B બન્ને D)એકપણ નહી

271. એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા સ્વીફટ કોડ (Swift Code)નું પૂરું નામ જણાવો.
A)સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્સ ટેક
B)સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર
C)સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાઈનાન્શીયલ ટ્રાન્ઝેક્શન
D)સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન

256)C, 257)D, 258)B, 259)B, 260)C, 261)A, 262)D, 263)B, 264)C, 265)A, 266)A, 267)D, 268)C, 269)B, 270)B, 271)D.

272. 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન......નું છે.
A)આલ્બર્ટ આઈન્સ્ટાઈન B) ગાંધીજી
C)સરદાર પટેલ D) જવાહરલાલ નેહરુ

273. નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત (Nationalised) બેંક નથી ?
A)બેંક ઓફ બરોડા B) વિજ્યા બેંક
C) આઈ.સી.આઈ.સી.આઈ. D)દેના બેંક

274. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ)ની શરૂઆત ક્યારથી થઈ ?
A) 1-1-2014 B) 1-1-2015 C) 1-1-2016 D) 1-4-2015

275. માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી -
A)કિન્ડલ બર્જર B) જિરાલ્ડ મેયર
C) માઈકલ ટોડેરો D) મહેબૂબ ઉલ હક

276. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો ?
A) 1-9-2012 B) 19-6-2013 C) 19-9-2013 D) 19-9-2015

277. આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACESનું પૂરું નામ શું છે?
A) TDS Record Analysis and Correction Enabling system
B) TDS Reconciliation Analysis and correction enabling System
C) Tax Rate Computer Excess Sestem
D)A, B, C પૈકી એકપણ નહી

278. આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી .... બાદ મળવાપાત્ર નથી.
A)PPFનું રોકાણ B) મકાન લોનનુ મુદ્દલ
C)જીવન વિમા પ્રિમિયમ D)સેવિંગ ખાતાનું વ્યાજ

279. અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્‌ભવે ?
A)આયાતો સસ્તી બને B) આયાતો મોંઘી બને
C)નિકાસો મોંઘી બને D)નિકાસો સસ્તી બને

280. નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ?
A)નાણાં મંત્રી B)પ્રધાનમંત્રી C) રાષ્ટ્રપતિ D)ઉપરાષ્ટ્રપતિ

281. નેશનલ સ્ટોક એક્ષચેંજ (NIFTY)માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ?
A) 30 B) 50 C) 100 D) 500

282. વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?
A)વ્યસ્ત સંબંધ છે B) સીધો સંબંધ છે
C)ઊંધો સંબધ છે D) કોઈ સંબંધ નથી

283. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)નું મુખ્ય મથક ક્યા છે ?
A)મુંબઈ B)નવી દિલ્હી C) અમદાવાદ D)ભોપાલ

284. રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ?
A) રૂ.50,000 B) રૂ.1,00,000
C) રૂ.2,00,000 D)ઉપરોક્ત પૈકી એકપણ નહી

CSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

285. SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ?
A) 1995 B) 1999 C) 1992 D) 2000

286. રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ?
A) 1934 B) 1937 C) 1947 D) 1949

HTAT - 2014

287. TDS એટલે ? : ટેક્સ ડિડક્ટ એટ સોર્સ

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

288. ભારતીય ચલણી નોટ એ......... છે. - પ્રોમીસરી નોટ
289. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારોકરવામાં આવે તો - વેપારી બેંકોએ વ્યાજ વધુ ચૂકવવું પડે.
290. ક્યા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી ? - ગિફન
291. બેંક સામાન્ય રીતે ક્યા ખાતા પર વ્યાજ આપતી નથી ? - ચાલુ ખાતુ
292. રોજગારી ગુણકનો ખ્યાલ ક્યા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ? - પ્રો.આર.એફ.કાહન
293. RTGS એટલે શું ? - Real Time Gross Settlement

કલાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

294. GSTનો અમલ ક્યારથી થનાર છે ? - જુલાઈ-2017

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર - 2012

295. EPCGનું આખું નામ શું છે ? - Export Promotion for Capital Goods
296. ખેતીને લગતા ધિરાણો માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ ? - NABARD
297. BPOનું આખું નામ શું છે ? - Business Process Outsourcing
298. ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્ષ એ - વેચાણ પરનો ટેક્ષ છે
299. વસ્તુની માંગ એટલે શું ? - આપેલ કિંમતે એક સમયગાળામાં વસ્તુના જથ્થાની માંગ
300. પ્રોમિસરી નોટ પર કોણ સહી કરશે ? - લખનાર
301. CENVATનું આખું નામ નીચેનામાંથી કયું ? - Central Value Added Tax

272)A, 273)C, 274)B, 275)D, 276)C, 277)B, 278)D,279)B, 280)B, 281)B, 282)B, 283)B, 284)C, 285)C, 286)A.

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

302. સંરક્ષણ નિતીની બાળ ઉદ્યોગની દલીલ મુખ્ય કયા અર્થશાસ્ત્રીએ કરી છે? - **ફેડરિક લિસ્ટ**

303. રિઝર્વ બેન્ક કાનુની પ્રવાહિતા પ્રમાણ (SLR) ઘટાડે તો શું પરિણામ આવે? - **બેન્કોની ઓછી રોકડ રકમ સરકારી જામીનગીરીઓમાં રોકાય**

304. સંકીર્ણ નાણું (Narrow Money) એટલે શું? - **જે સૌથી ઓછું પ્રવાહી છે.**

305. દેશમાં કયા વર્ષ પછી થયેલા કૃષિ વિકાસને 'હરિયાળી ક્રાંતિ' નામ આપવામાં આવ્યું? - **1968**

306. ભારતમાં સ્પીડ પોસ્ટમાં સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી? - **ઈ.સ.1986થી**

પ્રોબેશન ઓફિસર - 2016

307. ભારતમાં સામુદાયિક વિકાસના કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનાથી શરૂ થયા હતા ? - **પ્રથમ**

308. આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? - **ભારત સરકારના ઠરાવ દ્વારા**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

309. NIFTY કયા શેરબજારનો સૂચકાંક છે ? - **NSE**

310. ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? - **નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD**

311. Demonitisaion પાછળની મુખ્ય હેતુ શું છે ? - **કાળાનાણાંને નાથવા, આતંકવાદ સામે લડવા, નકલી નોટોના કારોબારને ખતમ કરવા**

312. તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ'(BHIM)નું પૂરું નામ શું છે ? - **Bharat Interface for Money**

313. ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ? - **લોખંડ-પોલાદ**

314. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ? - **કાળુ નાણું**

315. આર્થિક દ્રષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ? - **વિકાસશીલ**

316. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે ? - **રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા**

317. અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ? - **અંદાજપત્ર**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

318. માંગની અનુસૂચિના બધા જ પદો કેવા હોય છે ? - **એકબીજાના વૈકલ્પિક**

319. ભારતની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઈ છે? - **બેકારી**

320. આર્થિક વિકાસ કોને કહે છે ? - **લોકોના જીવનધોરણમાં સુધારાને**

321. જ્યારે વિનિમય થાય ત્યારે ખરીદનાર અને વેચનાર કઈ બાબત અંગે સંમત થાય છે.? - **વસ્તુની કિંમત**

322. ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ કયા નામે ઓળખાય છે ? - **વૈશ્વિકીકરણ**

323. કિંમત નિર્ધારણમાં ટૂંકાગાળામાં કયું પરિબળ મહત્વનું અને નિર્ણાયક બને છે ? - **માંગ**

324. ભારતના બદલાયેલા સ્વરુપમાં આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કયા ક્ષેત્રને સોંપવામાં આવી છે ? - **ખાનગી ક્ષેત્રને**

325. ત્રીજા વિશ્વના દેશોને .... કહેવામાં આવે છે. - **વિકાસશીલ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

326. આર્થિક અને સામાજીક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે ? - **અર્થશાસ્ત્રીઓ**

327. કયા પ્રકારના અંદાજપત્રમાં સરકારી ખર્ચને મહેસુલી આવક વડે સરભર કરવામાં આવે છે? - **પુરાંતવાળા**

328. 'માનવ મુડી' નો ખ્યાલ રજુ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા ? - **માર્શલ**

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર ક્લાર્ક - 2012

329. 'નેશનલ સ્ટોક એક્સચેન્જ' (NSE)ની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે ? - **મુંબઈ**

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

330. રેપોરેટ અને રિવર્સ રેપોરેટનું નિયમન કોણ કરે છે ? - **રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા**

331. ઈરડા (IRDA) એ કયાં ક્ષેત્રનું નિયમન કરે છે? - **વીમા**

332. પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુધ્ધિકરણ પ્લાન્ટ (Common Effluent Treatment Plant)શરુ કરવામાં દેશનું કયું રાજય પ્રથમ ક્રમે આવે છે ? - **ગુજરાત**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

333. નીતિપંચનું અધ્યક્ષ પદ કોણ ધરાવે છે ? - **વડાપ્રધાન**

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

334. NEFT-National Electronic Funds Transferમાં રોકડેથી વધુમાં વધુ કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? - **રૂ.50,000**

335. આધુનિક અર્થવ્યવસ્થામાં અનેક પ્રવૃત્તિઓને સાંકળતી મહત્વની કડી કઈ છે ? - **નાણું**

સબ ઓડિટર - 2015

336. ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? - **આર.કે. સન્મુખમ શેટ્ટી**

337. CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે? - **નાણાંનો પુરવઠો ઘટે છે.**

338. ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં કરવામાં આવ્યું? - **1949**

339. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ક્યા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે ? - **અશિક્ષિત યુવાનો**

340. ભારતમાં શણ ઉદ્યોગ ક્યા દેશની મૂડીથી સ્થાપયો હતો ? - **ઈંગ્લેન્ડ**

341. ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે ? - **માળખાગત**

TAT - 2012

342. ક્યા વડાપ્રધાને જુલાઈ 1969માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું ? - **ઈન્દિરા ગાંધી**

PSI - 2012

343. NBFCનું પૂરૂ નામ શું છે ? - **નોન બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપનીઝ**

344. ઈરડા (IRDA)એ કઈ ક્ષેત્રનું નિયમન કરે છે ? - **વિમા**

345. બીજી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો કયો હતો ? - **1956-61**

PSI નશાબંધી - 2011

346. SIR એટલે શું ? - **Special Investment Region**

347. રૂપિયાની નોટો છાપવાની શરૂઆત ક્યા વર્ષમાં થઈ ? - **1861**

348. ભાવ વધારાને માપવા માટેના સૂચકાંક-W.P.Iનું પૂરું નામ કયું છે ? - **હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ**

આંકડાકીય અધિકારી - 2000

349. ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર કોની સહી હોય છે ? - **કેન્દ્રીય નાણાં સચિવ**

350. ભારતમાં ક્યા વર્ષથી રેલવે બજેટને સામાન્ય બજેટથી પ્રથમ વખત અલગ રજૂ કરવામાં આવ્યું ? - **1924**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

351. IRDA કઈ બાબતનું નિયમન કરે છે ? : **વીમો (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)**

352. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે પૂર્ણ થઈ ? : **1956**

353. 2011ના સેન્સસ મુજબ ગુજરાત રાજ્યની કુલ કેટલા ટકા વસતી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ? - **42.6**

354. 1986માં સુધારેલા 20 મુદ્દાના કાર્યક્રમના પ્રણેતા ક્યા વડાપ્રધાન હતા ? : **રાજીવ ગાંધી**

355. ભારતમાં સૌથી મોટી વ્યાપારી બેંક કઈ છે? : **સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા**

356. ડિયર મની (ટાઈટ મની) કોને કહેવાય ? : **વ્યાજનો ઊંચો દર**

357. ભારતમાં સૌપ્રથમ આવકવેરાની શરૂઆત ક્યારે થઈ ? : **ઈ.સ. 1860 (જેમ્સ વિલ્સન દ્વારા)**

358. કેન્દ્રીય આંકડાકીય સંગઠન (CSO)નું વડુમથક ક્યા આવેલ છે? - **નવી દિલ્હી**

359. ભારતમાં સૌથી વધુ ક્યા ખેડૂતોની ટકાવારી જોવા મળે ? - **સીમાંત**

360. રજત ક્રાંતિનો સંબંધ કઈ ઉત્પાદકતામાં વધારો છે ? - **ઈંડા**

361. ભારતમાં કેટલા વર્ષે કૃષિગણના થાય છે ? - **5 વર્ષ**

362. DMICનું પૂરું નામ આપો. - **દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર**

363. સ્વર્ણિમ ચતુર્ભુજની શરૂઆત ક્યા વર્ષથી થયેલી ? - **1999**

364. ભારતમાં સૌપ્રથમ ગરીબી માપવાની રીત કોણે આપી હતી ? - **દાદાભાઈ નવરોજી**

365. ચેમ્પિયન સેક્ટરના વિકાસ માટે પ્રયત્નો શરૂ થયા છે તેની જવાબદારી ક્યા મંત્રાલયને સોંપાઈ છે ? - **ઈન્ડસ્ટ્રીયલ પોલિસી અને કોમર્સ મંત્રાલય**

366. ગરીબી માપન માટે વર્ષ 2004માં કઈ સમિતિની રચના કરાઈ હતી ? - **સુરેશ તેંડુલકર સમિતિ**

367. WPIનો અર્થ શું થાય ? - **હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ**

368. બેંક ક્યા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? : **કરન્ટ ખાતું**

369. ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો ? : **1991થી**

370. સરકારી કર્મચારીને મળતું એક સામટું પેન્શન ______ છે. : **સંપૂર્ણરીતે કરમુક્ત**

371. નાણાંની માંગના હેતુઓ ______ છે. : **ત્રણ**

372. કઈ લોન પેટે ટીઝર રેટ લાગુ પાડવામાં આવે છે ? - **હોમ લોન**

373. ભારતના ગ્રામિણ વિસ્તારોમાં ગરીબી માપન લગત કેટલી ઓછામાં ઓછી સરેરાશ કેલીરીની જરૂર છે ? - **પ્રતિવ્યક્તિ પ્રતિદિન 2400 કેલરી**

374. આકારણીની કાર્યવાહી અને કર વસૂલાતના સંદર્ભમાં કાયમી ખાતા નંબર (PAN) કઈ કલમ હેઠળ આવે છે ? : **કલમ 139A**

375. હાલમાં ભારત દેશમાં બાયો ફ્યુઅલ શામાંથી બનાવાય છે ? - **મોલાસીસ**

376. માનવ વિકાસ આંકનું મૂલ્ય .... વચ્ચે હોય છે ? : **0 થી 1**

377. સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને .... : **અસામાન્ય બગાડ**

378. RBI ____ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. : **રૂ. 1**

379. ખેતી વાડી ક્ષેત્રે અને ગ્રામ્ય વિકાસની લોન માટે પુનઃ ધિરાણ કોણ આપે છે ? - **નાબાર્ડ**

380. વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ કઈ સંસ્થા બહાર પાડે છે? - **વિશ્વ આર્થિક ફોરમ**

381. ભારતમાં સૌપ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી ? : **1951**

382. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સ્થાપના ક્યારે થઈ ? : **1992**

383. ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રિયકરણ _____ વર્ષમાં કરવામાં આવ્યું ? : **1969**

384. બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને .... કહેવામાં આવે છે. : **રિવર્સ રેપોરેટ**

385. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત .... વર્ષમાં થઈ હતી. : **1966-67**

386. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ......% જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઈએ. : **20**

387. હાલમાં ફ્લીપકાર્ટ કંપનીને કઈ કંપનીએ હસ્તગત કરી ? - **વોલમાર્ટ**

388. ભારતમાં શહેરી વિસ્તારોમાં બી.પી.એલ પરિવારોની ઓળખ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી છે ? - **એસ.આર.હાશિમ સમિતિ**

389. સરકાર તરફથી ટેકો અને માન્યતાનો અભાવ ભારતના ક્યા ક્ષેત્રનું લક્ષણ છે ? - **અસંગઠિત ક્ષેત્ર**

390. પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ, 2002ની અમલવારીની જવાબદારી નાણાં મંત્રાલયના ક્યા વિભાગની છે ? **- રાજસ્વ (મહેસુલ) વિભાગ**

391. અરક્ષિત શ્રમ બજાર ભારતના ક્યા ક્ષેત્રનું લક્ષણ છે ? - **અસંગઠિત ક્ષેત્ર**

392. આઈ.એમ.એફ. દ્વારા ભારતનો ક્વોટા અને મતહિસ્સો વધારાયા પછી, 184 સભ્યોના સંગઠનમાં ભારત ક્યા સ્થાને છે? - **8મા**

393. ડિજિ શાળા ચેનલ ક્યા મંત્રાલય દ્વારા મુકવામાં આવી છે ? **- ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય**

394. ટીપા દીઠ વધુ પાક (પર ડ્રોપ મોર ક્રોપ)એ કોનો ચાવીરૂપ ધ્યેય છે ? - **NABARD હેઠળનું સૂક્ષ્મ સિંચાઈ ફંડ**

395. સરફેસી એક્ટ 2002 ક્યા હેતુ માટે બનાવવામાં આવેલો છે ? - **બાકી નાણાંની વસુલાત કરવા**

396. લોકશાહી પ્રકારના આયોજનમાં ક્યા પ્રકારની સ્વતંત્રતા જળવાઈ રહે છે ? - **આર્થિક**

397. ડિજિટલ સિગ્નેચર ....છે. **બિનરદિયોને આધાર આપતી ક્રાઈપ્ટોગ્રાફિક પદ્ધતિ**

398. ઓ.ઈ.સી.ડી.એફ.એ.ઓ. એગ્રીકલ્ચરલ આઉટલૂકના અહેવાલ મુજબ વર્ષ ....સુધીમાં ભારત સૌથી મોટું દૂધ ઉત્પાદક બની જશે. - **2026**

399. બારમી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં માથાદીઠ ગરીબી........ જેટલી ઘટાડવાનો ઉદ્દેશ હતો ? - **10 ટકા**

400. ક્યા પાકના ખેતરોમાં પાણી ભરાઈને રહે તે જરૂરી છે ? - **ચોખા**

401. નિર્દેશાત્મક પ્રકારના આયોજનમાં ક્યા પ્રકારની સ્વતંત્રતા જળવાઈ રહે છે ? - **આર્થિક**

402. ફૂગાવો, બચત ઉપર અવળી અસર, અસમાનતામાં વધારો, ચૂકવણીના સંતુલનની સમસ્યાઓ કઈ નાણા વ્યવસ્થાનું પરિણામ છે ? - **ખાદ્ય પુરક નાણા વ્યવસ્થા**

403. ભારતમાં ખાદ્ય ધિરાણનો ઉપયોગ............... માટે સંશોધનો ઊભા કરવા સારુ થાય છે. - **આર્થિક વિકાસ**

404. અંદાજપત્રમાં અંદાજપત્રીય ખાધ અને બજારમાંથી મેળવેલા ઋણને શું કહેવાય ? - **રાજકોષીય ખાધ**

405. નવી જાહેર કરેલ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર આરોગ્ય ખર્ચને GDPના કેટલા ટકા વધારવા માટેનો પ્રસ્તાવ છે? - **1.2થી 2.5%**

406. મિનિમમ સપોર્ટ પ્રાઈઝ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે ? - **ભારત સરકાર**

407. યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની લિ.ને ભારતમાં કઈ બાબત સાથે સાંકળવામાં આવ્યું છે ? - **સામાન્ય વિમા નિગમ**

408. છેલ્લી ત્રણ પંચવર્ષીય યોજનાઓમાં ક્યું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં મોટો ફાળો આપી રહ્યું છે ? - **સેવા ક્ષેત્ર**

409. વસતી વિષયક સંક્રમણના સંદર્ભે તબક્કો 1 કોને કહેવાય ? - **ઊંચો મૃત્યુદર અને ઊંચો જન્મદર**

410. ભારત સરકાર ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણા વર્ષમાં કેટલીવાર કરે છે ? - **બે વખત**

411. બેંકો સાથે સંબંધિત મિશન ઈન્દ્રધનુષ શું છે ? - **જાહેર ક્ષેત્રની બેંકોને પુનઃ કાર્યક્ષમ બનાવવી**

412. મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચમાં વધારો થાય તેને અંદાજપત્રમાં શું કહેવાય ? - **મહેસૂલી ખાધ**

413. ભારતમાં રાજ્ય નાણાકીય નિગમો મુખ્યત્વે .... વિકસાવવા આર્થિક સહાય આપે છે.- **સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસો**

414. અંદાજપત્રમાં રાજકોષીય ખાધ એટલે ? **- બજેટની ખાધ+ સરકારનું ચોખ્ખુ ઋણ**

415. ડિજિ શાળા ચેનલ કઈ બાબતને આગળ ધપાવવાનું વધુ એક પગલું છે ? - **ડિજિટલ વ્યવહારોને**

416. અગત્યની આઠ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પૈકી ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં કોનો સમાવેશ થાય છે ? - **રિફાઈનરી પ્રોડક્ટ, સ્ટીલ, વીજળી**

417. બ્રેન્ટ સૂચકાંક........ **સાથે** સંકળાયેલું છે. - **કાચા તેલ(ક્રૂડ ઓઈલ)ના ભાવ**

418. નવમી પંચવર્ષીય યોજનામાં સર્વ શિક્ષણ અભિયાન (SSA)ની શરૂઆત......માટે થઈ હતી. - **પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ**

419. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિ. કઈ બાબતની સેવા પૂરી પાડે છે ? - **સામાન્ય વિમો**

420. અંદાજપત્રમાં કુલ આવક કરતા કુલ ખર્ચમાં વધારો થાય તેને શું કહેવાય ? - **અંદાજપત્રીય ખાધ**

421. આબીદ હુસેન સમિતિ કઈ બાબત સાથે સંલગ્ન હતી ? - **સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ**

422. 2017ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિનો ધ્યેય જન્મ સમયે અપેક્ષિત આયુષ્યમાં ....**વર્ષ સુધીનો** વધારો કરવાનો છે ? - **70 વર્ષ**

423. એફ.આર.બી.એમ. અધિનિયમની સમીક્ષા કરતી એક સત્તાવાર સમિતિએ સરકારી ખાધ સુધારી....... કરવા ભલામણ કરી છે. - **જીડીપીના 60%**

424. કૃષિ ક્ષેત્રમાં ક્યું નૈતિક ચિંતા બની શકે છે ?
- **વનસ્પતિમાં પ્રાણી જનીનો નાખવા**

425. પાકના વધારે ઉત્પાદનના કિસ્સામાં ભાવમાં અચાનક મોટો ઘટાડો થાય તે રાજ્યમાં શું ઉપયોગી બને છે ? - **મિનિમમ સપોર્ટ પ્રાઈઝ**

426. RBI દ્વારા મીના હેમચંદ્ર સમિતિની રચના શા માટે કરવામાં આવી હતી ? - **સાયબર સુરક્ષા**

427. GSTનું જાહેરનામુ ક્યારે પ્રસિદ્ધ થયેલ ? - **12 એપ્રિલ, 2017**

428. ભારતમાં સૌથી વધારે કોલસો .... દ્વારા વપરાય છે.- **વિદ્યુત ઉત્પાદન**

429. આર્થિક સુધારાઓ દાખલ કરવા જવાબદાર છે ? - **કુસંવો, વધતી રાજકોષીય ખાધ, વિદેશી મુદ્રા ભંડોળમાં થઈ રહેલો ઘટાડો.**

430. ડિજિ શાળા ચેનલનું સંચાલન કોના દ્વારા થશે ? - **દૂરદર્શન**

431. માનવ વિકાસ સૂચકાંક સાક્ષરતા દર, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને ....નું બનેલું છે. - **યુ.એસ. ડોલરમાં રાષ્ટ્રીય માથાદીઠ આવક**

432. દેશના નિવાસીઓ અને બાકીના વિશ્વ વચ્ચેના તમામ વ્યવહારોની નોંધ રાખવાની દ્વિનોંધી પદ્ધતિને ....કહે છે. - **લેણ-દેણની તુલા**

433. GSTમાં મનોરંજન કરનો સમાવેશ થયેલ છે, આ વિધાન ? - **સાચું છે.**

434. મહારત્ન તરીકેની ગણના માટેની યોગ્યતા જણાવો.
- **છેલ્લા 3 વર્ષ દરમિયાન રૂ.5,000 કરોડથી વધુનો કર પછીનો સરાસરી વાર્ષિક ચોખ્ખો નફો.**

435. ખેડૂતો અનાજનું ઉત્પાદન કરે છે અને તેને કઈ બાબત દ્વારા ચોક્કસ ભાવની ખાત્રી મળે છે ? - **મિનિમમ સપોર્ટ પ્રાઈઝ**

436. સૂચિત નવી શૈક્ષણિક નીતિ માટે ટી.એસ.આર. સુબ્રમણ્યમ સમિતિએ ભલામણ કરી છે કે શિક્ષણ ઉપરનો ખર્ચ GDPના ઓછામાં ઓછું .... વધારવો જોઈએ. - **6%**

437. રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંસાધનોથી મર્યાદિત હોય છે. એવું કોણે કહ્યું છે ? - **ડબલ્યુ.એસ. લુઈસ**

438. OECD ભારત માટે શું છે ? - **ભારતીય નિકાસ માટેનું સૌથી મોટું બજાર**

439. સેન્સેક્સમાં વધારો એટલે.......- **મુંબઈ સ્ટોક એક્સચેન્જ સાથે નોંધાયેલી કંપનીઓના જૂથના શેરના ભાવમાં એકંદર વધારો**

440. ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, 2016 હેઠળ વ્યક્તિઓ માટેની નાદારી પ્રક્રિયા કેટલા દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ છે ? - **180**

441. માઈક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ એક્ટ, 2006 મુજબ સૂક્ષ્મ ઉત્પાદન એકમોના વર્ગીકરણની મૂડીરોકાણની મર્યાદા જણાવો. - **રૂ.25 લાખ**

442. બહુપરીમાણીય ગરીબી સુચકાંક એક નવું સૂચકાંક છે જેનો સમાવેશ........ માં થયો છે. - **માનવ વિકાસ અહેવાલ**

443. ભારતમાં સ્વચ્છ ભારત ઉપકરનો દર શું હતો ? - **0.5%**

444. કૃષિ પેદાશની છૂટક અને જથ્થાબંધ કિંમત પર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે કઈ સમિતિ સંકળાયેલી છે ?
- **અભિજીત સેન સમિતિ**

444. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના, 2015 હેઠળ કેટલા ગ્રામ સુધીના બોન્ડ ખરીદી શકાય છે ? - **1 ગ્રામથી 500 ગ્રામ**

445. સ્પર્ધાત્મક અને અનિયંત્રિત બજાર ક્યા ક્ષેત્રનું લક્ષણ છે ? - **ભારતના અસંગઠિત ક્ષેત્રનું**

446. નીતિ આયોગ મુજબ ભારતમાં રહેણાંક અને વાણિજ્ય ક્ષેત્રો દ્વારા કુલ વીજળીના કેટલા ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે ? - **29%**

447. ભારત સરકારે પંચવર્ષીય આયોજન બદલીને....... કર્યું છે.
- **15 વર્ષીય દૂરંદેશી દસ્તાવેજ**

448. ગ્રીન હાઈવે પોલિસી, 2015 હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસના પ્રોજેક્ટ્સના નાગરિક ખર્ચમાંથી કેટલો હિસ્સો ઝાડના વાવેતર માટે અલાયદો રખાય છે ? - **1%**

449. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના, 2015 હેઠળ કઈ બેંકો મારફત બોન્ડ ખરીદી શકાય છે ? - **શેડ્યુલ કોમર્શિયલ બેંકો**

450. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ.ને ભારતમાં કઈ બાબત સાથે સંબંધ છે ? - **સામાન્ય વિમા નિગમ**

451. કઈ સંસ્થા નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓની મોજણી કરે છે ? - **RBI**

452. કેશ રીઝર્વ રેશિયો (CRR) શું છે ? - **કુલ થાપણોની ન્યુનતમ રકમ કે જે બેંકે આર.બી.આઈ. પાસે રાખવાની હોય છે**

453. આયોજન પંચ મુજબ કેવા લોકોને ગરીબી રેખા હેઠળ સમાવવામાં આવ્યા છે ? - **ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં વ્યક્તિદીઠ 2400 કેલેરી અને શહેરી વિસ્તારમાં એક દિવસમાં વ્યક્તિદીઠ 2100 કેલેરી ન મેળવી શકતા**

454. હવાલા વ્યવહારો શું છે ? - **વાસ્તવમાં તબદિલી થયા વિના નાણાંનું હસ્તાંતરણ**

455. ટ્રાયબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ.ની સ્થાપના ક્યારે થઈ હતી ? - **1987**

456. ભારતમાલા પરિયોજનાના પ્રથમ તબક્કાની દરખાસ્તને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ક્યારે મંજૂરી આપી હતી? - **ઓક્ટોબર 2017**

457. એક અંદાજ મુજબ 2026માં ભારતની કાર્યરત વસતી .... હશે. - **68.4%**

458. ક્યો કર સુધારો ભારતમાં સૌથી તાજેતરનો ગણાય ?
- વસ્તુ અને સેવા કર બિલ

459. વૈશ્વિકરણના પાસા જણાવો. - **વેપારી અવરોધનો ઘટાડો, રાષ્ટ્રો વચ્ચે મૂડી મુક્ત અવર-જવર પૂરી પાડવી, રાષ્ટ્રો વચ્ચે ટેકનોલોજીના મુક્ત પ્રવાહને સ્વીકૃતિ આપવી**

460. સેન્ટ્રલ રેવન્યૂ બોર્ડ ક્યા વર્ષમાં સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ ડ્યૂટી બોર્ડ તથા સેન્ટ્રલ ડાયરેક્ટર ટેક્સિસ બોર્ડમાં વિભાજીત થયું ? - **1963**

461. બીજી પેઢીના સુધારાઓ કરવા કયું વાજબી છે ? - **કૌશલ્ય વિકાસ, પર્યાવરણ સુરક્ષા, સંમિલિત વૃદ્ધિ અને પોષણક્ષમ વિકાસ**

462. ભારતના ક્યા રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંક ઊંચો છે પરંતુ આવકનું સ્તર નીચું છે ? - **કેરળ**

463. એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? - **નીતિ આયોગ અને આંધ્ર પ્રદેશ સરકાર**

464. અનુસૂચિત બેંકોના નિરીક્ષણના વ્યાપક અધિકાર ભારતીય રિઝર્વ બેંકને ક્યા વર્ષના અધિનિયમથી મળેલા છે ? - **1949**

465. ભારતીય રિઝર્વ બેંકની ફેબ્રુઆરી 2019ની અધિસૂચના અનુસાર પ્રાદેશિક ગ્રામીણ બેંક સોના સામે વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકે છે? - **રૂ.2 લાખ**

466. અંદાજપત્રીય અભિગમ કે જેમાં નિર્દિષ્ટ સાધનોનો ઉપયોગ સેવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલ હોય તેને શું કહેવાય ?
- કામગીરી આધારિત અંદાજકામ

467. નવીન જાહેર થયેલ ભારત-22..........છે. - **નવીન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ**

468. શૂન્ય આધારિત અંદાજકામ સંચાલકર્તાને ફરજ પાડે છે.
- દરેક અંદાજપત્રીય વર્ષની શરૂઆતમાં જ તમામ ખર્ચ વ્યાજબી ઠેરવવા

469. આંતરિક ઋણનો ક્યો સ્રોત જાહેર બચતનો હિસ્સો છે ?
- ચાલુ મહેસૂલની શેષ, જાહેર સાહસોનું અધિશેષ, વધારાના સાધનો એકઠા કરવા

470. ફૂટલૂઝ ઉદ્યોગ એટલે શું ? - **એવા ઉદ્યોગો જે સ્થાન વિશેષ સાથે જોડાયેલા નથી.**

471. કુલ આવક, ઓછા ઉધારથી કુલ ખર્ચ વધુ હોય તેને ખાધ કહેવાય ? - **રાજવિત્તીય ખાધ**

472. શિક્ષણની ઉપલબ્ધતાનો અભાવ ભારતમાં કઈ બાબતનું સૂચક ગણાય છે ? - **ગરીબી**

473. અંદાજપત્રીય કરમુક્ત આવક ઉપર અંદાજપત્રીય ખર્ચના અતિરેકને કહેવાય છે. - **રાજકોષીય ખાધ**

474. 14મા નાણાં પંચે વનાચ્છાન માટે કેટલા ટકા મહત્ત્વ આપ્યું છે?
- 7.5%

475. માનવ વિકાસ સૂચકાંકમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?
- સાક્ષરતા, અપેક્ષિત આયુષ્ય, માથાદીઠ આવક

476. સ્વાસ્થ્ય સંભાળની ઉપલબ્ધતાનો અભાવ ભારતમાં કઈ બાબતનું સૂચક ગણાય છે ? - **ગરીબી**

477. નાના અને માર્જિનલ ખેડૂતોને કોણ ધિરાણ આપે છે ? - **RRB**

478. ફુગાવા દરમિયાન બેંક રેટ ..... જોઈએ. - **વધવો**

479. વિકાસ કે જે ભાવિ પેઢીઓની જરૂરિયાતો સંતોષવા માટેની ક્ષમતાનું સમાધાન કર્યા વગર વર્તમાનની જરૂરિયાતોને પહોંચી વળે છે તેવા વિકાસને કહેવાય ? - **પોષણક્ષમ વિકાસ**

480. નોકરીની તકોનો અભાવ ભારતમાં કઈ બાબતનું સૂચક ગણાય છે ? - **ગરીબ**

481. ટૂંકા સમય માટે રિઝર્વ બેંક પાસેથી નાણાં કરજ પેટે લેવા માટે વ્યવસાયિક બેંક જે વ્યાજ ચૂકવે તેને કહેવાય. - **રેપો દર**

482. વસતી ગણતરી 2011 મુજબ શહેરી વિસ્તાર તરીકેની લાયકાત ગણનાના માપદંડમાં સમાવેશ થાય. - **વિસ્તારની કુલ વસતી, વસતી ગીચતા, બિનકૃષિ વ્યવસાયની ટકાવારી**

483. MRTP એક્ટના સ્થાને હવે ...... છે. - **કોમ્પિટિશન કમિશન**

484. નવા ઉદ્યોગોને રક્ષણ આપવા સારૂં જકાત લાદવાનો ધ્યેય શું છે?
- મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને વિદેશી હરિફાઈ સામે રક્ષણ આપવું

485. બેંકના દરો ઘટવાથી કઈ અસર થાય ? - **નાણાં પુરવઠો વધે અને ઋણ લેવાનો ખર્ચ ઘટે**

486. અંદાજ કામની એક રીત કે જે પ્રવર્તમાન આયોજન, અંદાજકામ અને પુનઃ નિરીક્ષણ પ્રક્રિયાને અભિવાદિત કરે છે અને જોડે છે?
- કામગીરી અંદાજકામ

487. વડાપ્રધાનનો પગાર અને ભથ્થા ખર્ચ બિનમતપાત્ર ખર્ચ નથી, આ વાક્ય ? - **સત્ય છે**

488. 1991થી વિદેશ વ્યાપાર નીતિના સુધારા ....ની તરફેણ કરે છે. - **બહિર્મુખી વ્યૂહરચના**

489. નાની બચત અને પ્રોવિડન્ડ ફંડ..........ઘટક છે.
- પબ્લિક એકાઉન્ટ

490. પાયાગત કૃષિ ધિરાણના પ્રવાહ પર દેખરેખ રાખવાનું કાર્ય કોનું છે ? - **નાબાર્ડ**

491. સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ક્યા વર્ષના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટના એજન્ડા સંદર્ભે છે ? - **2030**

492. લવાદ પદ્ધતિની સમીક્ષા તથા સંસ્થાગત માળખાની રચના માટે ભારત સરકાર દ્વારા કોની અધ્યક્ષતા હેઠળ સમિતિની રચના કરી ? - **બી.એન.શ્રીકિષ્ના**

493. કૃષિ ક્ષેત્રમાં ધિરાણનું આયોજન અને દેખરેખ નિયંત્રણનું કાર્ય કોણ કરે છે ? - **નાબાર્ડ**

494. ભારતમાં M_3........છે. - **વિસ્તૃત નાણું**

495. નિર્ગમન નીતિ મુખ્યત્વે ....ને સામેલ કરે છે. - **માંદા અને બિનકાર્યક્ષમ એકમો બંધ કરવા**

495. 1973 74માં આવક વેરાનો સૌથી વધુ સીમાવર્તી દર.........હતો ? - **97.75%**

496. વૈશ્વિકરણ અને મુક્ત વેપાર.........ના સીધા પરિણામો છે ? - **આંતરરાષ્ટ્રીય વેપાર અંગે રિકાર્ડોએ આપેલા તુલનાત્મક ખર્ચ તફાવત સિદ્ધાંત**

497. રિજિયોનલ રૂરલ બેંક (RRB)માં કોણ મૂડી રોકાણ કરે છે ? - **સંબંધિત રાજ્ય સરકાર**

498. ખેતી ઉપર આધાર રાખવો તે ક્યા પ્રકારના દેશની મુખ્ય લાક્ષણિકતા ગણાય ? - **અવિકસિત દેશની**

499. GST કાયદા હેઠળ ક્યા સપ્લાયરને કોમ્પોઝિશન યોજનાનો લાભ મળી શકે ? - **જે સપ્લાયર રાજ્યમાં જ માલ કે નિર્દિષ્ટ સેવાનો પુરવઠો કરે અને તેનું ટર્નઓવર નિર્ધારિત મર્યાદામાં હોય.**

500. સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંગે જણાવો. - **ઝીરો હંગર, લક્ષ્યાંક માટે ભાગીદારી**

501. જથ્થાના આધારે વસ્તુ પર લાદવામાં આવે છે તેને ...... કહેવાય છે. - **સ્પેસિફિક વેરો (વિશિષ્ટ વેરો)**

502. પુનઃ ઉત્થાન વ્યાપાર ચક્રનો તબક્કો દર્શાવે છે,આ વિધાન ? - **સત્ય છે**

503. ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટે કાર્યકારી માર્ગદર્શિકા તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે ? - **નાબાર્ડ**

504. 1991થી વિદેશ વ્યાપાર નીતિના સુધારા..........ની તરફેણ કરે છે. - **બહિર્મુખી વ્યૂહરચના**

505. ભારતમાલાના પહેલા તબક્કામાં અંદાજે કુલ કેટલા કિ.મી.ના માર્ગો વિકસાવવાનું આયોજન છે ? **24,800 કિ.મી.**

506. કુલ આવક, ઓછા ઉધાર અને વ્યાજ ચૂકવણીથી કુલ ખર્ચ વધુ હોય તેને કઈ ખાધ કહેવાય ? - **પ્રાથમિક ખાધ**

507. માલ અને સેવા કર (GST) સંદર્ભે સાચુ વિધાન ક્યું છે ? - **તે માલ અને સેવા કે બંનેના વપરાશ ઉપરનો વેરો છે અને સામાન્ય રીતે જે જગ્યાએ વપરાશ થાય છે તે પ્રદેશને આ વેરો મળે છે.**

508. જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેંચીને બેંકો RBI પાસેથી નાણાં ઉછીના લે તે દરને .... કહેવાય. - **રેપો રેટ**

509. GST અનુસાર બિન પંજીકૃત વ્યક્તિ દ્વારા પંજીકૃત વ્યક્તિને પૂરા પાડવામાં આવતા કરપાત્ર માલ કે સેવા કે બંનેનો કર કોના દ્વારા ચૂકવવાપાત્ર છે ? - **માલ કે સેવા મેળવનાર**

510. નિર્ગમન નીતિ મુખ્યત્વે.........ને સામેલ કરે છે. - **માંદા અને બિનકાર્યક્ષમ એકમો બંધ કરવા**

511. કૃષિ કલ્યાણ સેસનો દર કેટલો હતો ? - **0.5%**

512. સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસીઝ એક્ટ, 2017 હેઠળ રિવર્સ ચાર્જ એટલે શું ? - **માલ કે સેવા અથવા બંનેનો પુરવઠો મેળવનારની ટેક્સ ભરવાની જવાબદારી**

513. ....નાણાકીય નીતિનું એક આડકતરુ અને ગુણાત્મક પગલું છે. - **માર્જિન પદ્ધતિ**

514. ગરીબી, આવકના નીચા સ્તર અને બેરોજગારી કઈ બાબત અંગેનો મુખ્ય નિર્દેશક છે ? - **અવિકસિત હોવા અંગેનો**

515. પેટ્રોલ પર કેટલા ટકા GST છે ? - **પેટ્રોલને GST કાયદામાં આવરી લેવાયુ નથી**

516. નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયાબિલિટિસ શબ્દ ક્યા ક્ષેત્રમાં વપરાય છે ? - **બેંકિંગ ક્ષેત્ર**

517. જ્યારે કરાઘાત અને કરસંપાત એક જ વ્યક્તિ પર પડે તેને ...... કહે છે. - **સીધો વેરો**

518. 11મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય શું હતું ? - **ભારતમાં વ્યાપક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનું**

519. IGSTનું પૂરું નામ આપો. - **ઈન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ**

520. સરકારને પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા દ્વારા થતી આવકને શું કહેવાય છે ? - **મહેસૂલી આવક**

521. IMPS શું છે ? - **મોબાઈલ દ્વારા નાણાં ચૂકવવાનું માધ્યમ-પ્લેટફોર્મ**

522. ફુગાવાને નાથવા RBI.......નાણાં નીતિ ઉપયોગમાં લે છે. - **મોંઘી**

523. RBI દ્વારા મોનેટરી પોલિસીની સમીક્ષા કેટલા માસે કરવામાં આવે છે ? - **દર બે માસ**

524. મીનીમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરતી વખતે સામાજિક ખર્ચ અને લાભને ધ્યાને લેવાતા નથી, આ વાક્ય - **સત્ય છે**

525. આયાત-નિકાસ પર કઈ ડ્યૂટી લેવામાં આવે ? - **કસ્ટમ ડ્યૂટી**

526. નીચો માનવ વિકાસ આંક ક્યાં પ્રકારના દેશની મુખ્ય લાક્ષણિકતા ગણાય ? - **અવિકસિત દેશની**

527. RBI દ્વારા ઓપન માર્કેટ ઓપરેશન દરમિયાન - **સરકારી સિક્યુરિટી ખરીદ-વેચાણ કરવામાં આવે છે.**

528. પાછલી યોજનાઓના નહીં ચૂકવાયેલા ખર્ચાઓ બજેટમાં ક્યા ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે ? - **નોન પ્લાન એક્સપેન્ડિચર**

529. ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? - **નીતિ આયોગ, DIPP, CII**

530. સરકાર દ્વારા સેન્ટ્રલ બેંકમાંથી ધિરાણ મેળવવામાં આવે તો બજારમાં નાણાંનો પુરવઠો ? - **વધશે**

531. ડેમોગ્રાફીક ડિવિડન્ડ મેળવવા શું કરવું જરૂરી છે ? - **સ્કીલ ડેવલપમેન્ટની તકો વધારવી**

532. સરકારને જાહેર નફા પેટે થતી આવકને શું કહેવાય છે ? - **મહેસૂલી આવક**

533. શેડ્યુલ્ડ બેંક એટલે કેવી બેંક ? - **ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની દ્વિતીય અનુસૂચિમાં હોય**

534. HDI (હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ) કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? - **UNDP**

535. બંધારણના અનુચ્છેદ 366 (12-A) મુજબ GSTની વ્યાખ્યા અનુસાર કઈ વસ્તુને કરમાંથી બાકાત રાખવામાં આવેલ છે ? - **માનવ વપરાશ માટેનો આલ્કોહોલીક લીકર**

536. વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે મળતી રકમ સરકારને કેવી આવક છે ? - **મહેસૂલી આવક**

537. FRBMA, 2003 (ફિસ્કલ રિફોર્મ્સ એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ) ક્યારથી અમલમાં આવેલો છે ? - **5 જુલાઈ, 2004**

538. કઈ પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય ભારતીય અર્થ વ્યવસ્થામાં આત્મ નિર્ભરતા હાંસલ કરવાનું હતું ? - **પાંચમી પંચવર્ષીય યોજના**

539. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શબ્દો ક્યા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે ? - **RBI દ્વારા નાણાં પ્રવાહ ઉપર નિયંત્રણ રાખવા વ્યાજદર નક્કી કરવા**

540. વ્યાજની ચૂકવણી બજેટમાં ક્યા ખર્ચ તરીકે લેવામાં આવે છે ? **- નોન પ્લાન એક્સપેન્ડિચર**

541. ગિલ્ટએજ્ડ બજાર એટલે. - **સરકારી જામીનગીરીઓની બજાર**

542. મિશ્ર અર્થતંત્રની વિભાવના એટલે ? **- જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ**

543. મીનીમમ સપોર્ટ પ્રાઈઝ કારણે ડાંગરની વાવણી-કઠોળની વાવણી કરતા ઓછી જોખમી છે, આ વિધાન - **સત્ય છે**

544. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા મોડલ પર આધારિત હતી ? - **હેરોલ્ડ ડોમર મોડલ**

545. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીઝ એક્ટ, 2017ની જોગવાઈ મુજબ IGST વેરાશાખ (ઈનપુટ ટેક્સ ક્રેડિટ)નો ઉપયોગ કેવી રીતે થઈ શકે ? - **IGST ભરવા માટે અને વધે તો CGST ભરવા માટે અને ત્યારબાદ વધે તો SGST ભરવા માટે**

546. કેન્દ્રીય આબકારી જકાત ભરવાની જવાબદારી સામાન્ય રીતે ......ની થાય છે. - **ઉત્પાદક**

547. ઈન્ક્લુસિવ ગ્રોથમાં કઈ બાબતનો સમાવેશ થાય ? - **ગરીબીમાં ઘટાડો, રોજગારીની તકોમાં વધારો, જેન્ડર ઈનઈક્વાલિટી દૂર કરવી.**

548. સંરક્ષણને લગતા ખર્ચાઓને બજેટમાં ક્યા ખર્ચ તરીકે ગણવામાં આવે છે ? - **નોન પ્લાન એક્સેપન્ડિચર**

549. એનર્જી સ્ટેટેસ્ટિક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? **- આંકડા અને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન મંત્રાલય**

550. કંપનીની આવક પર ક્યો કર ગણાય ? - **કોર્પોરેટ કર**

551. દેશની અંદર ઉત્પાદન થયેલ માલ પર કઈ ડ્યૂટી લાગે ? - **એક્સાઈઝ ડ્યૂટી**

552. RBI દ્વારા ECB ધોરણોનું ઉદારીકરણ કર્યું છે તે ECB એટલે શું? - **એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઈન્ગ્સ**

553. સેન્ટ્રલ બેંક દ્વારા સરકારી જામીનગીરીની ખરીદી વખતે બજારમાં ? - **નાણાંનો પુરવઠો વધશે**

554. જ્યારે વ્યાજનો દર ઘટાડવામાં આવે છે ત્યારે ? **- રોકાણો અને તેના સંબંધિત ખર્ચાઓ વધે છે**

555. CGST એક્ટની કલમ 39(1) અનુસાર માસિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછીના મહિનાની..........તારીખ છે, આ રિટર્ન GSTR-3ના નમૂનામાં ફાઈલ કરવાનું હોય છે. **- 20**

556. બેંકો દ્વારા પ્રાયોરિટી લેન્ડીગ અપાય છે તેમાં સમાવેશ થાય. **- કૃષિ ધિરાણ, નબળા વર્ગને ધિરાણ, માઈક્રો અને લઘુ ઉદ્યોગોને ધિરાણ**

557. ઉન્નત ભારત અભિયાન 2.0નો મુખ્ય કાર્યક્રમ...... દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. - **માનવ સંસાધન વિકાસ મંત્રાલય**

558. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ જેવા શબ્દો ક્યા ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે ? - **બેંકિંગ ક્ષેત્ર**

559. અર્થતંત્રના વિકાસને સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે ? - **તેજી ઈન્ફલેશન**

560. નિમ્ન જીવન ધોરણ અને વ્યાપક ગરીબી ક્યા પ્રકારના દેશની મુખ્ય લાક્ષણિકતા ગણાય ? - **અવિકસિત દેશની**

561. માનવ અને કુદરતી સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કઈ બાબત અંગેનો મુખ્ય નિર્દેશક છે ? - **અવિકસિત હોવા અંગેનો**

562. જીઓ પેમેન્ટ બેંક એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અને .... બેંકનું સંયુક્ત સાહસ છે. - **ભારતીય સ્ટેટ બેંક**

563. ક્યા કરવેરા ઘટાડવામાં આવશે તો કાળા નાણાંનું સર્જન ઘટશે? **- આવકવેરો, મકાન/મિલકત ખરીદી પરનો વેરો, કેપિટલ ગેઈન ટેક્સ**

564. નાણાં સંસ્થાઓ દ્વારા માઈક્રો ફાઈનાન્સ આપવામાં આવે તેનો મુખ્ય હેતુ ક્યો છે ? - **ધિરાણ આપવું, બચતને પ્રોત્સાહન આપવું, વિમાનુ રક્ષણ આપવું, નાણાંની લેવડ-દેવડની સગવડો આપવી.**

565. દેશના બાહ્ય દેવાની દેખભાળ કોણ રાખે છે? - **નાણાં મંત્રાલય**

566. કયું શહેર ભારતનું પ્રથમ સ્માર્ટ શહેર બની ગયું છે જ્યાં દિવસના સમય દરમિયાન 100 % પુનઃ પ્રાપ્ય ઊર્જા ચાલે છે ? **- દિવ**

567. શુદ્ધ આંતરિક પેદાશ (નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની ગણતરીમાં કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી શું બાદ કરવામાં આવે છે ? - **ઘસારો**

568. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને શું કહેવાય ? - **કુલ આંતરિક પેદાશ**

569. બીજી પંચવર્ષીય યોજના ક્યા મોડલ પર આધારિત હતી ? - **મહાલનોબિસ મોડલ**

570. નીચી માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકમાં 70 ટકાથી વધુ કૃષિનો ફાળો અને ઉત્પાદનના સાધનોનો અયોગ્ય ઉપયોગ ક્યા અર્થતંત્રની નિશાની છે ? - **વિકાસશીલ અર્થતંત્ર**

571. RBIએ આર્થિક પ્રવૃત્તિઓ માપવા માટે કુલ મૂલ્ય ઉમેરોની જગ્યાએ ....નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. - **કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)**

572. સંસ્થાની રોજબરોજના કામ અંગેના સૂચનોની યાદી જેના કારણે કામ કરનાર લોકોની ક્ષમતામાં વધારો થવાથી સંસ્થાની કામગીરીમાં સુધારો થાય તેને શું કહેવાય છે ? **- સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર**

573. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના વર્તમાન ધોરણો કઈ સમિતિની ભલામણોના આધારે નિર્ધારિત કરાયેલા છે ? **- લીલી વાડેરા સમિતિ**

574. ક્યા આર્થિક સુધારા દ્વારા દેશની માર્કેટિંગ પ્રવૃત્તિઓમાં વિદેશી કંપનીઓની ભાગીદારી આવકારવામાં આવી છે ? - **વૈશ્વિકરણ**

575. પ્રથમ HDI રિપોર્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો ? - **1990**

576. GSSDF ક્યા વિસ્તારમાં ટ્રાન્ઝેક્શન માટે બનાવાઈ છે ? - **ગ્રામીણ વિસ્તાર**

577. ભારતની કઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સિંગાપોરની NET સાથે જોડવામાં આવી છે ? - **રૂપે (RuPay)**

578. ક્યારે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ ઉજવાય છે ? - **20 માર્ચ**

579. બજેટ દરમિયાન વિવિધ ખાધ ચર્ચામાં હોય છે. કુલ ખર્ચમાંથી મહેસૂલી આવક અને દેવું ઊભું ન કરતી મૂડી આવકો બાદ કરતા કઈ ખાધ પ્રાપ્ત થાય છે ? - **રાજકોષીય ખાધ**

580. જેન્ડર ઈન ઈક્વાલિટી ઈન્ડેક્સના માપનમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? - **સશક્તિકરણ, આર્થિક દરજ્જો, શાળાકીય અભ્યાસના વર્ષો**

581. ક્યા સમયગાળા દરમિયાન મોટાભાગની વસ્તુઓની આયાતો પરના નિયંત્રણો ઉત્તરો-ત્તર દૂર કરવામાં આવ્યા હતા ? **- 1991થી 2002**

582. આયાતિત વસ્તુનો ભાવ તેના ઉત્પાદનના દેશમાં પ્રચલિત ભાવ કરતા પણ ઓછો હોય ત્યારે તેને શું કહેવાય છે ? - **ડમ્પિંગ**

583. ઈલેક્ટ્રોનિક મની ઓર્ડર અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ મોકલી શકાય છે? - **રૂ.5,000**

584. મહારત્ન એકમ તરીકે માન્યતા ક્યા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે ? - **ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોનું મંત્રાલય**

585. પ્રથમ HDI રિપોર્ટ બહાર પડાયો તે ટીમના વડા કોણ હતા ? **- મહેબુબ અલ હક (પાકિસ્તાની)**

586. વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે ? - **155**

587. ભારત ડિપોઝિટરી રિસીપ્ટ શું છે ? - **વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં પોતાના શેર વેચવામાં આવે ત્યારે તેવા ખરીદનારને મળતા પ્રમાણપત્રો**

588. પ્રથમ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ક્યારે બહાર પડાયો હતો ? - **2012**

589. ધ ફીલીપ કર્વ કઈ બાબત અંગે માહિતી આપે છે ? **- બેરોજગારી અને ફુગાવાનો સંબંધ**

590. ત્રીજી પંચવર્ષીય યોજના કઈ યોજના પર આધારિત હતી ? - **ગાડગિલ યોજના**

591. શ્રમ કેન્દ્રીત તક્નીકો ઉપર વધુ અવલંબન કઈ બાબત અંગેનો મુખ્ય નિર્દેશક છે ? - **અવિકસિત હોવા અંગેનો**

592. યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)નો હેતુ જણાવો. **- દેશમાં કેશલેસ ઈકોનોમી શરૂ કરવી**

593. ક્યા કાર્યક્રમ હેઠળ કરદાતા દ્વારા ચૂકવવામાં આવતા કરવેરા અને બેંક ડિપોઝીટની ચકાસણી કરવામાં આવશે ? **- ઓપરેશન ક્લીન મની**

594. ઈન્ડિયા ઈનોવેટિવ ઈન્ડેક્સ કોના દ્વારા શરૂ કરાયેલ છે ? **- નીતિ આયોગ**

595. ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ ગણવામાં આવતી રાષ્ટ્રીય આવકને શું કહેવાય છે ? - **નાણાકીય રાષ્ટ્રીય આવક**

596. સ્વસ્તિકનો લોગો ક્યા સ્ટોક એક્સચેન્જનો છે ? - **અમદાવાદ સ્ટોક એક્સચેન્જ**

597. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના ક્યા ખર્ચાઓ ગણાતા નથી ? - **બદલા ચૂકવણી**

598. કેન્દ્ર સરકારનું અંદાજપત્ર...........દર્શાવે છે. **- રાજકોષીય નીતિના નિર્ણયોની દિશા**

599. વહીવટી સેવાઓ, પેન્શન અને નિવૃત્તિના લાભ પાછળ થતો ખર્ચ રાજ્ય સરકારના અંદાજપત્રના ખાતામાં ક્યા પ્રકારનો ખર્ચ છે ? - **બિન વિકાસલક્ષી ખર્ચ**

600. યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) કોના દ્વારા વિકસાવવામાં આવી છે? - **નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)**

601. ઉત્પાદનના સાધનોમાં કોનો સમાવેશ થાય છે ? **- જમીન, મૂડી, શ્રમ, વિભાજન**

602. ઓપરેશન ક્લીન મની કોના દ્વારા હાથ ધરાયેલ છે ? **- આયકર વિભાગ**

603. ક્યા ઈન્ડેક્સ અનુસાર ઈનોવેશન માટે દરેક રાજ્યને ક્રમ આપવામાં આવશે ? **ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ**

604. પ્રોપર્ટી ટેક્સ, વેલ્થ ટેક્સ, ગીફ્ટ ટેક્સ કોના દ્વારા લેવામાં આવે છે? - **રાજ્ય સરકાર**

605. જે રાષ્ટ્રીય આવકને પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવે તેને ક્યા પ્રકારની આવક કહે છે ? **- વાસ્તવિક આવક**

606. કરના આધારનું વિસ્તરણ કરવાનો અર્થ શું થાય ? **- જે વ્યક્તિઓ કે ધંધાઓ કર ભરવાપાત્ર છે પરંતુ ટાળે છે તેઓનો કર માળખામાં સમાવેશ કરવો**

607. ક્યા કાર્યક્રમ હેઠળ ઈ-વેરિફિકેશન દ્વારા બેંકમાં જમા કરવામાં આવેલી રકમની ચકાસણી કરવામાં આવશે ? **- ઓપરેશન ક્લીન મની**

608. ભારતમાં સર્વિસ ટેક્સની શરૂઆત ક્યારથી થઈ હતી ? - **1994-95**

609. ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ? - **ચોથી પંચવર્ષીય યોજના**

610. ઈન્ડિયા ઈનોવેટિવ ઈન્ડેક્સનું ક્યા ઈન્ડેક્સ સાથે જરૂરી સંકલન કરવામાં આવશે ? - **ગ્લોબલ ઈનોવેટિવ ઈન્ડેક્સ**

611. સંપત્તિની લાક્ષણિકતા જણાવો. - **ઉપયોગિતા ધરાવે છે, સ્પષ્ટ અસ્તિત્વ છે, વિનિમય કરવામાં સક્ષમ છે**

612. ચોથી પંચવર્ષીય યોજનાનો સિદ્ધાંત જણાવો. - **સ્થિરતા સાથે વૃદ્ધિ**

613. MRTP અધિનિયમ (1969)ના સ્થાને ક્યો અધિનિયમ આવ્યો? **- સ્પર્ધાત્મકતા અંગેનો કાયદો, 2002**

614. પ્રાથમિક સૂચકાંક વિસ્તારમાં વસતીમાં પ્રથમ ક્રમ ધરાવતું શહેર અને .....ની વસતીનો ગુણોત્તર છે. - **બીજો ક્રમ ધરાવતું શહેર**

615. ભારતીય બેંકમાં કમ્પ્યૂટરાઈઝેશન અંગેની સમિતિ (1988)ના અધ્યક્ષ કોણ હતા ? - **ડૉ.સી. રંગરાજન**

616. ખેતી વિસ્તારમાં ઘટાડો, કૃષિ રોજગારમાં ઘટાડો, ખરીદ શક્તિમાં ઘટાડો, ફુગાવાના દરમાં વધારો કઈ બાબતના ઘટકો છે ? - **દુકાળ**

617. હિંદુ વૃદ્ધિ દર એટલે શું ? - **1991 પહેલાનો ભારતીય અર્થતંત્રનો ખુબ જ નીચો વૃદ્ધિ દર**

618. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરતા બાકી રહેતી ખાધને શું કહે છે ? - **પ્રાથમિક ખાધ**

619. આઠ મુખ્ય આંતરમાળખાકીય સહાયક ઉદ્યોગો જેવા કે કોલસો, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રીફાઈનરી, ખાતર, સ્ટીલ, સીમેન્ટ અને વીજળી ઔદ્યોગિક ઉત્પાદન સૂચક આંક (IIP)માં આશરે .... ફાળો આપે છે ? - **38%**

620. કઈ સમિતિએ જૂન, 2016માં નવી શિક્ષણ નીતિ ઉપર પોતાનો અહેવાલ સુપ્રત કર્યો ? - **ટી.એસ.આર.સુબ્રમણ્યમ સમિતિ**

621. ચોખ્ખુ ઘરગથ્થુ ઉત્પાદનની ગણતરી કરવા માટે એકંદરે ઘરગથ્થુ ઉત્પાદનમાંથી કોની બાદબાકી કરવી પડે ? - **અવમૂલ્યન**

622. વ્યક્તિ એક વધારાના ડોલર/રૂપિયાની આવક પર જે કર દર ભરે છે તેને ...... કહેવાય છે. - **સીમાંત કર દર**

623. માથાદીઠ આવક એટલે ?

એકંદર રાષ્ટ્રીય આવક

કુલ વસતી

624. ભારતમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ? - **RBI**

625. કંપનીની અસ્કયામતો અને જવાબદારીઓ શેના પરથી જાણી શકાય ? - **કંપનીના સરવૈયા પરથી**

626. ભારતમાંથી ગરીબી નાબૂદ કરવા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા હિમાયત કરવામાં આવેલું PURAનું પૂર્ણરૂપ શું છે ? - **Providing Urban Amenities in Rural Areas**

627. ખાધવાળુ બજેટ સતત રજૂ કરવામાં આવે ત્યા સરકાર ક્યા પગલા લઈ શકે ? - **મહેસૂલી ખર્ચ ઘટાડવો, સહાયમાં ઘટાડો, યોજનાઓનું એકત્રીકરણ**

628. બેંકો પોતાની ડિપોઝીટ કોની પાસે રાખે છે ? - **RBI**

629. ફુગાવા દરમિયાન ......ને લાભ અને ......ને ગેરલાભ થાય છે. - **દેવાદાર, લેણદાર**

630. ગરીબી નાબૂદી એ ક્યો વિકાસ છે ? - **સામાજિક ન્યાય સાથેનો વિકાસ**

631. ખાધ પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વહેંચણી વગેરે બાબતો માટે ધોરણો કોણ નક્કી કરે છે ? - **ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા**

632. માઈક્રો એને મીડિયમ એન્ટરપ્રાઈઝને પ્રોત્સાહન ક્યા લક્ષ્યાંકો સિદ્ધ કરવા જરૂરી છે ? - **વ્યાપક વૃદ્ધિ**

633. બેંકોને જરૂર હોય ત્યારે તેને ધિરાણ કોણ કરે છે ? - **RBI**

634. જેની પાસે કંપનીઓના શેર હોય છે તે વ્યકિતઓને .... દરમિયાન લાભ થાય છે. - **ફુગાવા**

635. મુદલ અને વ્યાજદરનો ઉલ્લેખ તેમજ પૂરતી સુરક્ષા, સલામતી કઈ બાબતને મંજૂર કરતા વખતે ધ્યાને લેવાય છે ? - **લોન અને પેશગી**

636. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)નું ઓડિટ કોના દ્વારા કરાવવાનું ઠરાવેલ છે ? - **CAG**

637. જથ્થાબંધ ભાવ સૂચકાંક અઠવાડિયાના બદલે માસિક ધોરણે જાહેર કરવા અને WPI શ્રેણીની 435 ચીજવસ્તુને બદલે 1224 ચીજવસ્તુઓના સમાવેશની ભલામણ કરી હતી ? - **પ્રો.અભિજિત સેન સમિતિ**

638. અંદાજિત કેટલા ટકા લોકો ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? - **52%**

639. રાજા ચેલૈયા સમિતિની રચના કરવામાં આવી હતી ? - **કર સુધારણા**

640. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા પ્રમાણમાં.........છે. - **ઘણી ઓછી**

641. ....દરમિયાન ઉત્પાદકો, વેપારીઓ જેવા તમામ પ્રકારના વ્યવસાયી વ્યક્તિઓને લાભ થાય છે. - **ફુગાવો.**

642. રાષ્ટ્રીય અથવા વ્યક્તિગત આવકમાં વધારો........સાથેનો વિકાસ છે. - **સામાજિક ન્યાય**

643. રાઈટ ટુ એજ્યુકેશનનો અમલ ક્યા લક્ષ્યાંકો સિદ્ધ કરવા જરૂરી છે ? - **વ્યાપક વૃદ્ધિ**

644. નાણાકીય બાબતોમાં બેંકોને સલાહ કે આદેશ કોણ આપે છે ? - **RBI**

645. ભારતની રાષ્ટ્રીય આવકના કેટલા ટકા ભાગ કૃષિ પેદાશમાંથી મળે છે? - **26%**

646. અંદાજપત્રની જોગવાઈ અને પરત ચૂકવણીની મર્યાદા કઈ બાબત મંજૂર કરતી વખતે ધ્યાને લેવાય છે ? - **લોન અને પેશગી**

647. લગભગ કેટલો GDP ખેતીવાડી અને તેની સાથે સંકળાયેલ ક્ષેત્ર દ્વારા અપાય છે ? - **13.7%**

648. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ....ઉંમરના બાળકોને છ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. - **0થી 6**

649. ફૂટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની સ્થાપના થઈ હતી. - **ઓગસ્ટ, 2011**

650. સામાજિક ન્યાય અને સમાન વહેંચણી કઈ બાબત સાથેનો વિકાસ છે? - **સામાજિક ન્યાય સાથેનો**

651. સામાજિક સેવાઓ પાછળ થતો મૂડી ખર્ચ રાજયના અંદાજપત્રમાં .... ખર્ચ છે. - **વિકાસલક્ષી**

652. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક, 2013......... કુલ વસતી આવરી લે છે અને ખાદ્ય માટેના કાનૂની અધિકારને માન્ય રાખે છે - **67%**

653. દેવાથી પ્રાપ્ત થતી આવક કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં ક્યા ખાતા હેઠળ જમા થશે ? - **મૂડી ખાતા**

654. ભારતને .....ને બેવડું વસ્તુ અને સેવાકર (GST) મોડલ પસંદ કર્યું છે. - **કેનેડા**

655. સિક્યોરિટી એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ.........હેઠળ થયેલ છે. - **1972**

656. યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ કઈ બેંકની નવી એપ્લિકેશન છે ? - **RBI**

657. ચિત્તરંજન લોકોમોટીવ ઉત્પાદન એકમ ક્યા આવેલું છે ? - **આસનસોલ**

658. આર્થિક સેવાઓ પાછળ થતા મૂડી ખર્ચને રાજ્યના અંદાજપત્રમાં ક્યા ખર્ચ તરીકે દર્શાવાય છે ? - **વિકાસલક્ષી**

659. સિક્યોરિટી એપલેટ ટ્રિબ્યુનલ ક્યા વર્ષથી કાર્યરત થયેલ છે ? - **1997**

660. UPIમાં અનેક બેંક ખાતાઓને એક જ ID સાથે જોડી શકાય છે, આ વિધાન - **સત્ય છે**

661. આંતરરાષ્ટ્રીય તરલતા સમસ્યા.........ની બિનઉપલબ્ધતા સંબંધિત છે. - **ડોલર અને અન્ય દુર્લભ મુદ્રાઓ**

662. મઝગાવ ડોક ક્યા આવેલું છે ? - **મુંબઈ**

663. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કઈ આવક ગણવામાં આવે છે ? - **જમીન-મકાનના ભાડામાંથી થતી આવક, વર્ષ દરમિયાન મૂડી પર જામતું વ્યાજ, પુસ્તકોના કોપીરાઈટ્સ અને પેટન્ટમાંથી મળતી આવક**

664. ઋણ વસૂલી કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં ક્યા ખાતા હેઠળની આવકમાં જમા થશે ? - **મૂડી ખાતા**

665. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી, આ વિધાન - **સત્ય છે**

666. વર્ષ 2003થી સિક્યોરિટી એપલેટ ટ્રિબ્યુનલમાં સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવી છે ? - **3**

667. ભારતમાં સિક્કા બહાર પાડવાનો અધિકાર ભારત સરકારને છે તે બાબત કોઈન એજ એક્ટ........ માં દર્શાવેલ છે. - **1906**

668. ઈન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી (ICF) ક્યા આવેલી છે ? - **ચેન્નાઈ**

669. નાની બચત યોજનામાંથી થતી આવક કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં ક્યા ખાતા હેઠળની આવકમાં જમા થશે ? - **મૂડી ખાતા**

670. આલકોક એશડાઉન ગુ.લી. ક્યા આવેલી છે? - **ભાવનગર**

671. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું ખર્ચ ગણાતું નથી, આ વિધાન - **સત્ય છે**

672. પુનઃ ગઠનની કામગીરી/ફડચાંની કામગીરી ઝડપથી કરવા ધી ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ.........ની મુખ્ય જોગવાઈ છે. - **2015**

673. ....થી બજારના પરિબળોમાં મુક્ત રીતે આયોજન કરવાનું ઉત્તેજન મળે છે. - **ખાનગીકરણ**

674. ઈનક્રેડિબલ ઈન્ડિયાનું પ્રથમ માર્કેટિંગ કેમ્પેઈન ક્યા વર્ષમાં શરૂ કરાયું હતું ? - **2002માં**

675. ભારતમાં સિક્કા બનાવનાર કેટલી ટંકશાળ છે ? - **ચાર**

676. ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયામાં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યો રહેશે ? - **10**

677. 2017-18 બજેટનો મુખ્ય એજન્ડા શું હતો ? - **ટ્રાન્સફોર્મ ઈન્ડિયા, એનરજાઈઝ ઈન્ડિયા, ક્લીન ઈન્ડિયા**

678. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ક્યારે ચાલુ થયેલ હતી ? - **નવેમ્બર, 2015**

679. GST બિલ પસાર થતા ક્યા વેરાઓ નાબૂદ થશે ? - **સર્વિસ ટેક્સ, મૂલ્યવર્ધિત વેરો, એક્સાઈઝ ડ્યૂટી**

680. ગ્રાહકોની સ્વતંત્રતાને..........થી પ્રોત્સાહન મળે છે. - **ખાનગીકરણ**

681. ઈન્ક્રેડિબલ ઈન્ડિયા નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે ? - **અમિતાભ કાન્ત**

682. ધંધો કરવાની સુગમતા વધારવી અને ફડચા માટેના અલગ-અલગ કાયદાઓનું એકત્રીકરણ કરવું કઈ બાબતની જોગવાઈ છે ? - **ધી ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, 2015**

683. વિદેશ વેપારનીતિ 2015-2020 મુજબ ભારતની 2020 સુધીનો નિકાસ લક્ષ્યાંક કેટલો છે? - **900 બિલીયીન ડોલર**

684. ભારતની રાષ્ટ્રીય આવકમાં માધ્યમીક ક્ષેત્રનો ફાળો કેટલા ટકા છે?- **26.6%**

685. ભારતમાં સિક્કાઓની વહેંચણી કઈ રીતે થાય છે ? - **RBIની કરન્સી ચેસ્ટ અને અન્ય બેંકના માધ્યમથી**

686. 'કરના આધારનું વિસ્તરણ' (Expansion of tax base) નો શું અર્થ થાય છે? - **જે વ્યકિતઓ કર ભરવા પાત્ર છે પરંતુ કર ભરતા નથી તેઓના કર માળખામાં સમાવેશ કરવો.**

687. સમાન અર્થતંત્ર ક્યા વાક્ય સાથે સુસંગત છે? - **કરવેરાના માળખામાં ન આવરી લેવાયેલ આવક, નાણા.**

688. ન્યુટ્રીયન્ટ બેઝ સબસીડી (Nutrient Based Subsidy) કોણ નક્કી કરે છે? - **કેબીનેટ કમીટી ઓન ઈકોનોમીક અફેર્સ**

689. કોઈપણ દેશનું ચોખ્ખું સ્થાનિક ઉત્પાદન શોધવા કુલ સ્થાનિક ઉત્પાદનમાંથી શું બાદ કરવામાં આવે છે ? - **ઘસારો**

690. વર્ષ 2017-18ના બજેટની સાથે પ્રથમ વખત ક્યો દસ્તાવેજ રજૂ થયો? - **તમામ રાજ્યોના પ્રદર્શન અને પરિણામ દર્શાવતો સંયુક્ત દસ્તાવેજ**

691. 100 વ્યક્તિઓ એક કંપનીમાં નોકરી મેળવવા માટે જાય છે. કંપની તેઓને જણાવે છે કે કંપનીમાં નોકરી માટે જગ્યા છે પરંતુ તેઓ પૈકી કોઈપણ નોકરી માટે જરૂરી કૌશલ્ય ધરાવતા નથી. આવી બેરોજગારીને ક્યા પ્રકારની બેરોજગારી કહેવાય છે? - **માળખાકીયા બેરોજગારી**

692. ભારતમાં ક્યા પ્રકારની ખાદ્યનું નીતિવિષયક મહત્વ ગણાતું નથી? - **પ્રાથમિક ખાદ્ય**

693. જ્યારે સરકારના અંદાજ પત્રમાં મહેસુલી ખાતા તથા મૂડી ખાતાની આવકો કરતાં મહેસુલી ખાતા અને મૂડીખાતાનું ખર્ચ વધારે હોય ત્યારે ઉદ્‌ભવતી ખાદ્યને શું કહે છે? - **અંદાજપત્રીય ખાદ્ય**

694. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને કેવા પ્રકારની પેદાશ કહે છે? - **કુલ રાષ્ટ્રીય પેદાશ**

695. સિંચાઈથી સગવડો એ ક્યા પ્રકારનો ખર્ચ છે ? - **વિકાસલક્ષી ખર્ચ**

696. માનવ વિકાસ સૂચકાંક અનુસાર ભારતના રાજ્યો પૈકી ક્યા રાજ્યની કક્ષા આગળ છે ? - **કેરલ**

697. સમાનગુણી વસ્તુઓ ક્યા બજારનું લક્ષણ છે ? - **પૂર્ણ હરિફાઈ**

698. ''ચાલુ ખાતાની ખાધ'' એટલે શું ? **કુલ આયાત અને કુલ નિકાસ વચ્ચેનો તફાવત અને મળેલ હસ્તાંતરિત ચૂકવણાનો સરવાળો**

699. યુનીટ કન્ફર્મેશન રિસીપ્ટ શું છે ? - **ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બદલ વિદેશી રોકાણકારોને મળતા પ્રમાણપત્ર**

700. ભારતના વિવિધ શહેરોમાં રહેણાંક મકાનોના ભાવમાં થતો વધારો-ઘટાડો દર્શાવતો સૂચકાંક "RESIDEX" કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? - **નેશનલ હાઉસિંગ બેન્ક**

701. GST એ વસ્તુઓ અને સેવાઓ ઉપરનો ...... આધારિત કર છે. - **પહોંચાડવાનું સ્થળ**

702. ખુલ્લા બજારમાં પ્રક્રિયા (Open Market Operations) કોની નીતિનો એક અંશ છે ? - **રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા**

703. ભારતમાં આયોજન માટે માનવ-સંશાધન ક્ષેત્રે નવજાત શિશુ મૃત્યુ દર (Neo-Natal Mortality Rate) ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવા શિશુની કેટલી વય ધ્યાને લેવાય છે ? - **જન્મબાદના પ્રથમ 4 સપ્તાહ**

704. વિકસતા દેશોમાં ઓછા વિકાસ માટે ક્યો વિકલ્પ મુખ્ય કારણ છે ? - **મૂડીનો અભાવ**

705. પ્રમાણમાં વિકસિત અને આર્થિક મંદી ધરાવતા રાજ્યો અને દરેક રાજ્યના વિભાગોના સહઅસ્તિત્વને ક્યા નામે ઓળખવામાં આવે છે ? - **પ્રાદેશિક અસમતુલા**

706. શેરડી માટે યોગ્ય અને લાભપ્રદ કિંમત (Fair and Remunerative Price) કોણ નક્કી કરે છે ? - **આર્થિક બાબતોને સંબંધિત કેબીનેટ કમિટી**

707. ''ઈન્ટીગ્રીટી ઈન્ડેક્સ'' ડેવલપમેન્ટ (IID) કોના દ્વારા હાથ ધરવામાં આવી રહેલ છે ? - **સેન્ટ્રલ તકેદારી આયોગ અને IIM.A**

708. No Society can surely be flourishing and happy of which the far greater part of members are poor and miserable. આ પ્રખ્યાત વાક્ય ક્યા અર્થશાસ્ત્રીનું છે ? - **એડમ સ્મીથ**

709. ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? - **રિઝર્વ બેન્ક**

710. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓને નાણાંકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કર્યા પછીનું શેષ નાણાકીય મૂલ્ય એ.......પેદાશ છે. - **શુદ્ધ રાષ્ટ્રીય**

711. GSTને .... સુધારા અધિનિયમ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. - **101**

712. બજેટ 2017-18 માં પેમેન્ટ અને સેટલમેન્ટ માટે એક અલગ વિનિયામકીય બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ બોર્ડ કોના હેઠળ રહીને કાર્ય કરશે? - **રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)**

713. કઈ વિનિમય-દર વ્યવસ્થામાં મધ્યસ્થ બેંકની કોઈ ભૂમિકા હોતી નથી? - **સંપૂર્ણપણે લવચીક વ્યવસ્થા (Fully Flexible)**

714. વર્ષ 2016માં પૂર્વોત્તર રાજ્યોમાં ઔદ્યોગિક અને રોકાણગત પ્રોત્સાહન માટેની નીતિ North East Industrial and Investment Promotion Policy (NEIIP) માં સુધારો કરવામાં આવેલ છે. આ નીતિ ક્યાં વર્ષમાં બનાવવામાં આવી હતી. - **વર્ષ 2007**

715. ભારતની કુલ નિકાસમાં કૃષિ ઉત્પાદનની નિકાસનો અંદાજે કટલો ફાળો છે ? - **18 ટકા**

716. પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ વર્ષ 2018-19 સુધી વાવેતર હેઠળની કેટલી જમીનનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક છે? **- 50%**

717. વિવિધ દેશોની માથાદીઠ આવકના આધારે વિશ્વ બૅન્ક દ્વારા કરવામા આવતા વર્ગીકરણ મુજબ ભારત ક્યા આવક જૂથમાં સમાવિષ્ટ છે? - **નિમ્ન - મધ્યમ આવક જૂથ**

718. આવકવેરાની ધારાની કલમ...... મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમિયાન તેની અગાઉના વર્ષ/વર્ષોનું એરીયર્સ મળેલ હોય તો તેઓ ફોર્મ .... ભરીને કરરાહત મેળવી શકે છે ? - **80, 10 ઈ**

719. નોન બેંકીંગ ફાઈનાન્સિયલ કંપની (NBFC)નું રજીસ્ટ્રેશન ક્યા કાયદા હેઠળ કરાવવું જરૂરી છે ? - **કંપનીઝ એક્ટ, 1956**

720. માનવ ગરીબીમાં આંકનું સૂત્ર. - $P = \frac{P_1 + P_2 + P_3}{3}$

721. આરોગ્ય ક્યા ચાર પ્રકારના ઘટકોથી પ્રભાવિત છે ? - **અંગત ઘટકો, વાતાવરણીય ઘટકો, વર્તમાન સંજોગો, તકો**

722. ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે ? - **જુલાઈ-ઓગસ્ટ**

723. તબીબી સારવાર અંગે લીધેલ વીમા પ્રીમિયમની કપાત કઈ કલમ હેઠળ બાદ મળે છે ? - **કલમ-80D**

724. આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પુરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ...... તરીકે ઓળખવામાં આવે છે. - **વાઉચિંગ**

725. હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ? - **હુંડી સ્વીકારનારની**

726. ભારતમાં ક્યું વર્ષ વસતીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? - **1921**

727. નીતિ આયોગ (NITI)ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? - **આયોજન પંચ**

728. રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી તેનું પૂરું નામ જણાવો. - **પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી**

729. કંપની ઓડિટનો મુખ્ય હેતું શું છે ? - **કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી**

730. મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? - **SEBI**

731. આયોજનનું કાર્ય એટલે - **પસંદગીનું કાર્ય**

732. 1947થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ? - **અંકુશિત**

733. રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ એ કંપનીને માટે શું છે ? - ખોટ

734. ભારતમાં 1994થી ક્યા ટેક્સની શરૂઆત થઈ ? - **સર્વિસ ટેક્ષ**

735. ભારતના રાજ્યોમાં જીએસટી બીલને બહાલી આપનાર સૌપ્રથમ રાજ્ય ક્યું છે ? - **આસામ**

736. RBIએ પ્રથમ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર કોને બનાવ્યા ? - **સુધા બાલકૃષ્ણન**

737. ભારતનું ક્યું રેલવે સ્ટેશન સૌપ્રથમ સોલર (સૌર) શક્તિથી ચાલતું સ્ટેશન બન્યું ? - **ગુવાહાટી**

738. દેશનું પ્રથમ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર ક્યા રાજ્યમાં બનશે ? - **આંધ્ર પ્રદેશ**

739. નાણાંની અવૈધ હેરાફેરી એટલે શું ? - **નાણાંની અવૈધ હેરાફેરી એટલે નાણાંના સ્રોતને છુપાવવાની પ્રક્રિયા**

740. ઔદ્યોગિક એકમના યાંત્રિક સ્વયં સંચાલનને કારણે મોટી સંખ્યામાં કામદારો રોજગારી ગુમાવે છે ત્યારે તેને શું કહેવાય છે? - **રચનાગત બેરોજગારી**

741. બેંકોએ તેમના પ્રવાહી અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચે ચોક્કસ ગુણોત્તર જાળવી રાખવો જરૂરી છે. આ ગુણોત્તર એટલે ... - **SLR (વૈધાનિક તરલતા ગુણોત્તર/સ્ટેટ્યુટરિ લિક્વિડિટી રેશિયો)**

742. નાણાકીય જવાબદારી અને અંદાજપત્ર વ્યવસ્થા અધિનિયમ (FRBMA) શેના પર અંકુશ રાખવા માટે પસાર કરવામાં આવ્યો હતો ? - **બન્ને રાજવિત્તીય ખાધ અને મહેસૂલ ખાધ ઉપર**

743. 'ગતિમાન નાણું' (હોટ મની) કોનો ઉલ્લેખ કરવા માટે વપરાય છે ? - **વિદેશી વિત્ત (પોર્ટફોલિયો) રોકાણ**

744. કઈ બાબતનું ભારતમાં થોક મૂલ્ય સૂચકાંકમાં મહત્તમ ભારાંક છે? - **ઉત્પાદિત પેદાશ**

745. ભારતીય સિનેમામાં કેટલા ટકા FDIની મંજૂરી છે ? - **100%**

746. ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં કરવામાં આવ્યું? - **1949**

747. વસતી ગણતરીની આંકડાકીય માહિતીને કેવા પ્રકારની માહિતી કહેવાય ? - **ગૌણ માહિતી**

748. સ્ત્રી-પુરુષ જાતિ પ્રમાણ જાણવા માટેનો સ્રોત ક્યો ? - **દસ વર્ષીય વસતી ગણતરી**

749. ફોરવર્ડ માર્કેટ કમીશનનું વડુમથક ક્યા આવેલ છે ? - **મુંબઈ**

750. હાલમાં રાષ્ટ્રીય ક્રોમોડીટી એક્સચેન્જની સંખ્યા કેટલી છે ? - **છ**

751. ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ ઈન્ડેક્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? - **વિશ્વ બેંક**

752. રાજ્યોના પરામર્શમાં રાજ્ય દીઠ વૃદ્ધિ અને બીજા પરિમાણ થઈ શકે તેવા લક્ષ્યો સૌપ્રથમ વખત કઈ પંચવર્ષીય યોજનામાં સમાવવામાં આવેલ હતા ? - **દસમી**

753. પંડિત જવાહરલાલ નેહરુના અધ્યક્ષપણા હેઠળની કમિટીની ભલામણના આધારે ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી ? - **માર્ચ 1950**

754. નેશનલ એગ્રી-ફૂડ બાયોટેક્નોલોજી સેન્ટર (NABI) ક્યા આવેલ છે ? - **મોહાલી**

755. ભારત સરકારે નાણામંત્રીની અધ્યક્ષતા હેઠળ દેશની સરકાર દ્વારા સંચાલિત કેટલી બેંકોના મર્જર ઉપર ધ્યાન આપવા માટે મંત્રીઓની પેનલની રચના કરી છે ?- **21**

756. સપ્ટેમ્બર 2017માં ભારત સરકારે કઈ કંપનીને મહારાત્નનો દરજ્જો આપેલ હતો ? - **ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ**

757. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ શિક્ષિત દર 73.0% થયેલ છે. વર્ષ 2001ના શિક્ષિત દરમાં કેટલા ટકાનો વધારો થયેલ છે?- **8.2%**

758. નેશનલ હોર્ટિકલ્ચર મીશનની શરૂઆત ભારતની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી ? - **અગિયારમી**

759. SEBIની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ? - **1992**

760. ભારતીય ચલણની રૂપિયાની કઈ નોટ ઉપર મંગળયાનનો ફોટો પ્રિન્ટ થયેલ છે ? - **2000 રૂપિયાની નોટ**

761. INDALCO, HINDALCO, BALCO અને MALCO આ ચારેય કઈ ધાતુના પ્લાન્ટ છે ? - **એલ્યુમિનિયમ**

762. દેશના કર માળખામાં ધરમૂળ પરિવર્તન લાવનાર જી.એસ.ટી. બિલ ક્યારથી અમલમાં આવ્યું ? - **1 જુલાઈ, 2017**

763. કઈ કંપનીએ હેવમોર આઈસ્ક્રીમ હસ્તગત કર્યું ? - **દક્ષિણ કોરિયા-લોટે**

764. કેન્દ્ર સરકારે.......કઠોળની નિકાસ ઉપરના પ્રતિબંધો દૂર કર્યા. - **તમામ કઠોળ ઉપર કોઈ પ્રતિબંધ નહીં**

765. સરકારની કુલ આવક કરતા વધારે ખર્ચને .... કહે છે. - **મૂડી ખાધ**

766. 2011ના અંદાજો અનુસાર વિશ્વની કુલ વસતીના કેટલા ટકા વસતી ભારતમાં વસે છે ? - **17.5**

767. 2011ની વસતી ગણતરી અનુસાર ક્યું રાજ્ય સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ? - **અરૂણાચલ પ્રદેશ**

768. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં 'ઓપન માર્કેટ ઓપરેશન્સ' એટલે....... - **આર.બી.આઈ. દ્વારા સરકારી પ્રતિભૂતિનું ખરીદ અને વેચાણ.**

769. સરકાર દ્વારા નીતિ (NITI) આયોગને......... તરીકે ઓળખવામાં આવ્યો છે. - **સુશાસન માટેનું વાહન"**

770. કેન્દ્રીય સહકારી બેંકો........સાથે સીધા સંપર્કમાં હોય છે. - **રાજ્ય સહકારી બેંકો**

771. કોને દેશની આર્થિક કાર્યક્ષમતામાં વધારાનું માપન કરતું શ્રેષ્ઠ માપદંડ માનવામાં આવે છે ? - **વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો**

772. સર્વાધિક માથાદીઠ આવક....... ક્ષેત્રમાં વ્યસ્ત સક્રિય વસતીના પ્રમાણ સાથે વિપરિત સહસંબંધ ધરાવે છે. - **કૃષિ, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર**

773. ક્યુ નિકાસ ફાજલ માટેનું સૌથી વધુ યોગ્ય કારણ છે ? - **રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિકાસ**

774. તાજેતરમાં.......ક્ષેત્રમાં નિયમન માટે ભારતના સુરક્ષા અને ધોરણો સત્તામંડળનું ગઠન કરવામાં આવ્યું છે. - **ખાદ્ય પદાર્થો**

775. ખાદ્ય-ધીરાણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેની સર્વશ્રેષ્ઠ રીત કઈ છે ?.- **પરદેશી મદદ દ્વારા**

776. કોનો ફુગાવા ઉપર કામચલાઉ નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય ? - **નાણા પૂરવઠામાં ઘટાડો**

777. વર્ષમાં ફક્ત બે મહિના માટે અપૂરતો વરસાદ ધરાવતા વિસ્તાર માટે ક્યો પાક યોગ્ય છે ? - **કઠોળ**

778. મિશ્ર ખેતીની મુખ્ય લાક્ષણિકતા જણાવો. - **પશુપાલન અને પાકની ખેતી બંને**

779. ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર GIFT-IFSCએ તાજેતરના ગ્લોબલ ફાઈનાશિયલ ઈન્ડેક્સ 22માં .... સ્થાન મેળવ્યું છે. - **10મું**

780. કઈ નેટ બેન્કિંગ સેવાઓ તમામ સમયે ઉપલબ્ધ હોય છે ? - **IMPS (ઈમિડીયેટ પેમેન્ટ સર્વિસ)**

781. આર્થિક સમીક્ષા 2016-17 (ઈકોનોમિક સર્વે 2016-17)માં ત્રણ વિભાગો છે તેના યોગ્ય ક્રમ જણાવો. - **પરિપ્રેક્ષ્ય, અનુમાન અને અનવરત**

782. ગૌણ કૃષિ એટલે શું ? - **પ્રથાઓ અને પ્રક્રિયાઓ કે જે પ્રાથમિક કૃષિ વસ્તુઓનું મૂલ્યવર્ધન કરે**

783. ભારતમાં વિકાસની સ્વભાવિક પ્રણાલીમાં અનન્ય શું છે ? - **શ્રમનો કૃષિમાંથી સેવા ક્ષેત્રમાં સીધો બદલાવ**

784. નવીન વિકસાવાયેલ એપ્લિકેશન જીએસટી સુવિધા પ્રોવાઈડર (GSPs)નો ઉપયોગ........ દ્વારા થાય છે. - **GSTN સાથે ક્રિયાપ્રતિક્રિયા માટે કરદાતાઓ**

785. ભારતીય કૃષિનો મુખ્ય પ્રકાર ક્યો છે? - **નિર્વાહ કૃષિ**

786. ભારતમાં ગરીબી રેખાનો અંદાજ કાઢવા માટે કોણ સમયાંતરે નમૂના મોજણી હાથ ધરે છે ? - **રાષ્ટ્રીય નમૂના મોજણી સંસ્થા (નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન)**

787. જીએસટી કાયદાની જોગવાઈઓ મુજબ જીએસટીના દરો કોણ નક્કી કરે છે ? - **જીએસટી કાઉન્સિલ**

788. સરકારને ગબ્બરસિંહ ટેક્સ લાગુ કર દીયા' આ વિધાન કોનું છે? - **રાહુલ ગાંધી**

789. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની નિમણૂકની સત્તા કોની છે ? - **કેન્દ્ર સરકાર**

790. આર્થિક ઉદારીકરણની નીતિ ભારતમાં ક્યા વર્ષથી લાગુ પડી ? - **1991**

791. ભારતની ચલણી નોટ ક્યા પ્રકારની ગણાય ? - **વચનચિઠ્ઠી**

792. માંગના નિયમાનુસાર વસ્તુના ભાવમાં વધારો થતાં વસ્તુની માંગમાં શું ફેરફાર થાય ? - **વસ્તુની માંગ ઘટે**

793. ક્યા સમયગાળા દરમિયાન ભારતના વૃદ્ધિ દરને 'હિંદુ વૃદ્ધિ દર' કહેવામાં આવે છે? - **1950-80**

794. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે ? - **શૂન્ય અને એકની વચ્ચે**

795. આધાર વર્ષનો સૂચક આંક હંમેશા કેટલો હોય છે ? - **100**

796. ભારતમાં નવી વસતી નીતિ ક્યા વર્ષથી અમલમાં આવી ? - **2000**

797. એફ.બી.હોલીએ નફા અંગે ક્યો સિદ્ધાંત આપેલો છે ? - **જોખમનો સિદ્ધાંત**

798. ભારતમાં કોના દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે ? - **સંયુક્ત રાષ્ટ્રો**

799. ભારતમાં.........બેકારી જોવા મળે છે. - **માળખાગત**

800. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂક પામેલ ઊર્જિત પટેલ રિઝર્વ બેંકના કેટલામાં ગવર્નર છે ? - **24માં**

801. બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે? - **12%**

802. મૃત્યુદરમાં થતો ઘટાડો એ કેવા પ્રકારની વધઘટ છે ? - **દીર્ઘકાલીન**

803. બે બેન્કો વચ્ચે નક્કી થતા વ્યાજદરને ....કહે છે. - **કોલ મની રેટ**

804. બીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક વિકાસના પગલાને........ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. - **મહાલનોબિસ**

805. નાબાર્ડની રચના ક્યા વર્ષમાં થઈ ? - **1982**

806. સરેરાશ આયુષ્ય કેવી રીતે માપવામાં આવે છે ? - **એક જ વર્ષમાં જન્મેલા લોકો સરેરાશ કેટલા વર્ષ જીવે છે તેને આધારે**

807. બાળઉદ્યોગનો અર્થ શું થાય છે? - **નવો શરૂ થયેલ ઉદ્યોગ**

808. તેંડુલકર સમિતિની વ્યાખ્યા અનુસારની 2011-12ની ગરીબાની રેખા મુજબ ગુજરાતમાં ક્યા જિલ્લામાં સૌથી વધુ ગરીબી છે ? - **દાહોદ**

809. ભારતમાં સર્વિસ ટેક્સમાં ક્યા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે ? - **ટેલિફોન**

810. અર્થતંત્રની પારિભાષિક શબ્દભાષા મુજબ ક્યો શબ્દ કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા સાથે સંકળાયેલો છે ? - **એગ માર્ગ**

811. બિટકોઈન શું છે ? - **ક્રિપ્ટો (અદૃશ્ય) કરન્સી**

812. ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલા ટકા છે? - **17.5%**

813. બેન્કિંગ વ્યવહારોમાં MSFનું આખું નામ શું છે ? - **માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસિલિટી**

814. ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે ? - **75%**

815. રોજગારી ગુણકનો ખ્યાલ કોણે આપ્યો. - **કહાન**

816. બેન્ક રેટ = - **જે દરે RBI વેપારી બેન્કોને નાણાં ધીરે તે દર**

817. આદર્શ સૂચકાંક કોને કહેવાય છે ? - **ફિશરનું સૂત્ર**

818. તહેવારોમાં તૈયાર કાપડનાં વેચાણમાં થતો વધારો એ ક્યા પ્રકારની વધઘટનો નિર્દેશ કરે છે ? - **મોસમી**

819. બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો. - **ફિલિપ્સ**

820. ગરીબી માપવા માટે ક્યો આંક ઉપયોગી છે ? - **ગિની આંક**

821. પ્રશિષ્ઠ અર્થશાસ્ત્રનો બજારનો નિયમ કોણે રજૂ કર્યો ? - જે.બી.સે

822. તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004-05માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું ? - 25.7

823. શૂન્ય આધારિત બજેટનો અર્થ........ છે. - **અગાઉના વર્ષનો આંક શૂન્ય**

824. સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું હતું ? - **1969**

825. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો નિરપેક્ષ લાભ સિદ્ધાંત કોણે રજૂ કર્યો? - **એડમ સ્મિથ**

826. બેકારીનો કુદરતી દર એટલે શું ? - **બેકારીના જે દરે શ્રમ બજારમાં બેકાર લોકોની વર્તમાન સંખ્યા પ્રાપ્ત રોજગારીની સંખ્યા બરાબર હોય તે**

827. અસમતોલ વૃદ્ધિનો ખ્યાલ કોણે આપ્યો ? - **હર્ષમેન**

828. સી. રંગરાજન સમિતિએ તેના 2013ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ્ય વિસ્તારો માટે ગરીબી રેખા ગણી છે ? - **972 રૂ.**

829. હોટેલ, રેસ્ટોરા અને વ્યાપાર ક્ષેત્રે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? - **નમૂના સર્વેક્ષણ**

830. એગ્માર્કનેટ શું છે ? - **ખેત પેદાશોના બજારોની માહિતીનું એકત્રીકરણ કરવાનું નેટવર્ક**

831. રિઝર્વ બેંક કાનૂની પ્રવાહિતા પ્રમાણ (SLR) ઘટાડે તો શું પરિણામ આવે ? - **બેંકોની ઓછી રોકડ રકમ સરકારી જામીનગીરીઓમાં રોકાય**

832. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા વરાયેલા ગવર્નર ઊર્જિત પટેલનું જન્મ સ્થળ જણાવો. - **કેન્યા**

833. વિકસતા દેશોમાં કઈ બેકારી વધારે હોય છે ? - **પ્રચ્છન્ન બેકારી**

834. અર્થશાસ્ત્રની કલ્યાણકારી વ્યાખ્યા.......એ આપી. - **પ્રો.માર્શલ**

835. યુદ્ધ સમયે વસતુના ભાવોમાં થતો વધારો એ કેવા પ્રકારની વધઘટ છે ? - **અનિયમિત**

836. ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં પાયાની લઘુતમ સાત સેવાઓને પ્રાધાન્ય આપવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ હતો ? - **નવમી**

837. કઈ પંચવર્ષીય યોજનામાં આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઈનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવેલ હતો ? - **દસમી**

838. પર્વતીય વિસ્તાર વિકાસ કાર્યક્રમ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અને રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવેલ હતા ? - **આઠમી**

839. નેશનલ ઈન્વેસ્ટમેન્ટ ફંડની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ? - **2005**

840. કેન્દ્રીય બજેટ વર્ષ 2017-18માં આયોજિત અને બિન-આયોજિત એવા અલગ ભાગ રાખેલ નથી. બજેટમાં આયોજિત અને બિન આયોજિત એમ અલગ અલગ ભાગ ન હોવા જોઈએ તેવી ભલામણ કઈ સમિતિએ કરી હતી ? - **સી.રંગરાજન**

841. ક્યા નાણાં પંચની ભલામણમાં રાજ્યની જનસંખ્યા અને વનાચ્છાદન જેવા બે નવા માપદંડો ઉમેરાયા ? - **14મા**

842. બેન્કીંગ સુધારાઓ માટે કઈ સમિતિની રચના કરવામાં આવેલ હતી ? - **નરસિંહમન સમિતિ**

843. નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી ? - **ઈ.સ.1992**

844. ધી સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઈન ઈન્ડિયા (SEBI)ની રચના બિન-વૈધાનિક સંસ્થા તરીકે 1988ના વર્ષમાં થઈ હતી, તેને વૈધાનિક દરજ્જો ક્યારથી મળેલ છે ? - **તા.31-3-1992**

845. ભારતની વસતી ગણતરીમાં નગરોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ? - **6**

846. ભારત વિશ્વના લગભગ કેટલા ટકા અનાજ ઉત્પન્ન કરીને ત્રીજા સ્થાન પર છે ? - **11%**

847. ભારતના ક્યા રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી ડિસેમ્બર રાખવાની જાહેરાત કરેલ છે ? - **મધ્ય પ્રદેશ**

848. કૃષિમાંથી મળતી આવકને વર્ષ 2022 સુધીમાં બેગણી કરવા માટેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાભારત સરકારે એપ્રિલ 2016માં એક સમિતિની રચના કરેલ છે આ સમિતિના અધ્યક્ષ કોણ છે ? - **અશોક દલવાઈ**

849. ઓડિટ એટલે............- **હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વકની ચકાસણી અને તપાસ**

850. વાઉચીંગ એટલે શું ? - **ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું.**

851. અર્વાચીન અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે ? - **એડમ સ્મિથ**

852. ભારતમાં રોજગારી ક્ષેત્રે કોનું પ્રભુત્વ છે ? - **અસંગઠિત ક્ષેત્રનું**

853. આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACESનું પૂરું નામ શું છે? - **TDS Reconciliation Analysis and Correction Enabling System**

854. જરૂરિયાત કરતાં વધુ વ્યક્તિઓ કામમાં રોકાય ત્યારે ક્યા પ્રકારની બેરોજગારી સર્જાય છે ? - **પ્રચ્છન્ન**

855. ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવર્ષીય યોજનાથી અમલમાં આવ્યા ? - **પાંચમી પંચવર્ષીય યોજના**

856. 'Principles of Economics' પુસ્તક કોણે લખ્યું ?- **માર્શલ**

857. ક્યા પ્રકારની બેરોજગારીમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે ? - **પ્રચ્છન્ન બેરોજગારી**

858. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? - **વેપારી બેન્કોએ વ્યાજ વધુ ચૂકવવું પડે**

859. શૂન્ય આધારિત અંદાજપત્ર પદ્ધતિમાં જ્યારે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે ત્યારે દર વખતે તમામ પ્રવૃત્તિઓ માટે શું કરવામાં આવે છે ? - **પુનઃ મૂલ્યાંકન**

860. પગારદારના આવકના સ્રોત પર કપાતની રાશિ ક્યા સમયમાં જમા કરાવવાની હોય છે ? - **કર-કપાત કર્યાના માસના અંતે 7 દિવસમાં**

861. RTGS એટલે શું ? - **Real Time Gross Settlement**

862. 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? - **મોરારજીભાઈ દેસાઈ**

863. પાકું સરવૈયું શું બતાવે છે ? - **કોઈ ચોક્કસ તારીખે ધંધાની ચોક્કસ આર્થિક સ્થિતિ**

864. અસરકારક માંગના અભાવે ક્યા પ્રકારની બેરોજગારી સર્જાય છે ? - **ચક્રીય**

865. વાઉચિંગ એટલે શું ? - **ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું.**

866. ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ? - **નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન**

867. વિન્ડો ડ્રેસિંગ એટલે..........- **મિલકતોનું વધુ ઓછું મૂલ્યાંકન**

868. પ્રથમ આવકવેરા અધિનિયમ ક્યા વર્ષથી શરૂ થયેલ છે ? - **1860**

869. કોના મતે 'અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે.'? - **એડમ સ્મિથ**

870. 'કમ્પ્યૂટર આવવાથી ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને' આને ક્યા પ્રકારની બેરોજગારી કહેવાય ? - **ઘર્ષણજન્ય બેરોજગારી**

871. ગુજરાત રાજ્યમાં જી.એસ.ટી.નો અમલ ક્યારથી કરાયેલ છે ? - **1 જુલાઈ, 2017**

872. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી....... - **રોબિન્સ**

873. ભારતીય રિઝર્વ બેંક અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ? - **રિવર્સ રેપોરેટ**

874. ક્યા વડાપ્રધાન સમયમાં ઉદારીકરણના સુધારાની નીતિ અપનાવાઈ ? : **પી.વી. નરસિમ્હારાવ**

875. માનવ વિકાસ અહેવાલ કઈ સંસ્થા જાહેર કરે છે ? - **UNDP**

876. નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે........ : **મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય.**

877. રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્ર સંચાલનમાં સુધારાઓ સૂચવતી સમિતિ કઈ છે ? - **એન.કે.સિંઘ સમિતિ**

878. ઔદ્યોગિક પ્રક્રિયાઓના સ્વયં સંચાલનના કારણે મોટી સંખ્યામાં કામદારો રોજગારી ગુમાવે છે તેને..... કહે છે. - **સંરચનાત્મક બેરોજગારી**

879. કેટલા વર્ષથી ઉપરની ઉંમરવાળા સગીરને માત્ર ચાલુ ખાતા સિવાયના બીજા બધા પ્રકારના બેંક ખાતા ખોલાવવાની પરવાનગી છે ? - **10 વર્ષ**

880. સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ હેઠળ 2016ના માનવ અહેવાલની કેન્દ્રીય વિષય વસ્તુ............છે. - **દરેક માટે માનવ વિકાસ**

881. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં...........જેટલા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપવામાં આવી છે ? - **100%**

882. ભારતીય મત્સ્ય અને જળચર ઉછેર ક્ષેત્ર અનુક્રમે GDPના......... અને કૃષિ GDPના......પ્રદાન કરે છે. - **1.1% અને 5.15%**

883. ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે ? - **કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ**

884. અંદાજપત્રમાં રાજકોષીય ખાધનો અર્થ..........થાય છે. - **અંદાજપત્રીય ખાધ + નેટ સરકારી કરજનો સરવાળો**

885. 1991ના આર્થિક સુધારણાથી નિકાસમાં વૃદ્ધિ થઈ તો ક્યા હેતુથી આયાતમાં ઉદારીકરણ અપનાવાયું છે ? - **કાર્યક્ષમતા, ગુણવત્તા અને ટેકનોલોજી સુધારણા માટે**

886. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા પૂર્ણ સમયના સભ્યોશ્રીઓ કાર્યવંત છે ? - **4**

887. રિઝર્વ બેંક જે દરથી કોમર્શિયલ બેંકોને ઉધાર રકમ આપે છે તે દરને કહેવાય ? - **બેંક દર**

888. ઓક્ટોબર, 2016થી SDR બાસ્કેટમાં ક્યા ચલણનો પાંચમાં ચલણ તરીકે સમાવેશ થયો છે ? - **ચાઈનીઝ રેન મીનબી**

889. મિલકતના વેચાણ પર ક્યો કર લાગુ થાય ? - **મૂડી લાભ કર**

890. ક્યો વેરો માલ અને સેવા બંને પરનો વપરાશ વેરો છે અને સામાન્ય રીતે જે જગ્યાએ વપરાશ થાય તે પ્રદેશને આ વેરો મળે છે ? - **GST**

891. દેશની આંતરિક દેવાની વ્યવસ્થાનું ધ્યાન કોણ રાખે છે ? - **RBI**

892. સબસિડીને લગતા યોજનાઓના ખર્ચા બજેટમાં ક્યાં ખર્ચ તરીકે ધ્યાને લેવાય છે ? - **નોન પ્લાન એક્સપેન્ડિચર**

893. એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના ક્યાં વર્ષમાં થયેલ હતી ? - **1982**

894. કાયદાની છટક બારીનો ઉપયોગ કરીને કરદાતા કર ભરવાનું ટાળે તો તેને શું કહેવાય છે ? - **કરટાળો**

895. સ્વ સહાય જૂથને પ્રોત્સાહન ક્યા લક્ષ્યાંકો સિદ્ધ કરવા જરૂરી છે? - **વ્યાપક વૃદ્ધિના**

896. પેન્શન, બેકારી ભથ્થુ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ગણાતું નથી, આ વિધાન - **સત્ય છે**

897. ભારત સરકારના ક્યા વર્ષના બજેટમાં અટલ ઈનોવેશન મિશન, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલન્ટ યુટીલાઈઝેશન અને યુનીફાઈડ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવેલ છે ? - **વર્ષ 2015**

898. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચુકવણી બાદ કરતા બાકી રહેલી ખાધને........કહે છે. - **પ્રાથમિક ખાધ**

899. GST પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ? - **કેન્દ્રીય નાણાં મંત્રી**

સામાન્ય જ્ઞાન

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવાં જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?
   A) General Development Control Reforms
   B) General Development Control Regulations
   C) General Development control Rules
   D) General Development Controlling Regulations
2. 'વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો.
   A) લંબચોરસ : વિકર્ણ   B) વ્યાસ : ત્રિજ્યા
   C) ચોરસ : લંબચોરસ   D) દ્વિભાજક : ખૂણો
3. રાજસ્થાનના ઉદેપુર શહેર ખાતે ક્યું એરપોર્ટ આવેલું છે ?
   A) વિર દુર્ગાદાસ એરપોર્ટ
   B) મહારાજા ગાયકવાડ એરપોર્ટ
   C) મહારાજા શિવાજી એરપોર્ટ
   D) મહારાણા પ્રતાપ એરપોર્ટ

રેવન્યૂ તલાટી - 28/02/2016

4. સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?
   A) કલેક્ટરશ્રીને
   B) મામલતદારશ્રીને
   C) તાલુકા વિકાસ અધિકારીશ્રીને
   D) ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
5. 1 ચો. વાર (sq.yard) =...............ચો.મી. (sq. metre)
   A) 0.931626 B) 0.836126 C) 0.891263 D) 0.983126
6. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
   a) બાંગ્લાદેશ 1) ડૉલર
   b) કેનેડા 2) રિયાલ
   c) ચિલી 3) ટાકા
   d) ઈરાન 4) પેસો
   A) a-1, c-3, d-4, b-2   B) b-1, a-3, c-4, d-2
   C) c-3, d-1, a-2, b-4   D) d-1, b-2, c-4, a-3
7. મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.
   A) સુભદ્રા   B) અરુંધતી   C) અનસૂયા   D) યશોધરા
8. તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજય સરકારના સામાન્ય હુકમોને આધિન રહી.......વખતોવખત ઠરાવવું જોઈએ.
   A) સરપંચશ્રીએ   B) મામલતદારશ્રીએ
   C) તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ D) કલેક્ટરશ્રીએ
9. સૌરાષ્ટ્રના તુલશીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાનાં રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
   A) ઉષ્મજલ કુંડ   B) તત્પોદક કુંડ
   C) અગ્નજલ કુંડ   D) તત્પોજલ કુંડ
10. કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં.6 માં પાડવી.......
    A) મરજીયાત છે.   B) ફરજીયાત છે.
    C) જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
    D) જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
11. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
    a) ઝારખંડ 1) ગેંગટોક
    b) ત્રીપુરા 2) અગરતલા
    c) સિક્કીમ 3) દેહરાદુન
    d) ઉત્તરાખંડ 4) રાંચી
    A) a-2, b-3, c-4, d-1   B) b-1, a-3, c-4, d-2
    C) d-3, c-1, a-4, b-2   D) a-4, b-3, d-1, c-2
12. મહેસૂલી વર્ષ 1લી...............થી શરૂ થાય છે ?
    A) જુલાઈ   B) ઓગસ્ટ   C) સપ્ટેમ્બર   D) એપ્રિલ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

13. ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?
    A) દિલ્હી   B) મુંબઈ
    C) નાગપુર   D) આમાંથી કઈ નહીં
14. 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?
    A) ગુજ ટોક   B) ગુજ કોસ્ટ   C) ગુજ કોક   D) ગુજ ટાસ્ક
15. નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?
    A) જનરલ   B) ફિલ્ડ માર્શલ
    C) ચીફ માર્શલ   D) એડમિરલ

1)B, 2)A, 3)D, 4)B, 5)B, 6)B, 7)A, 8)D, 9)B, 10)B, 11)C, 12)B, 13)C, 14)A, 15)D.

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

16. દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ?
A) સેમસંગ B) મોટોરોલા C) નોકિયા D) એપલ

17. ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ?
A) એડમિરલ B) કમાંડન્ટ C) જનરલ D) કોમોડોર

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

18. ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?
A) દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર B) કલકત્તામાં મેટ્રો કંડક્ટર
C) મુંબઈમાં બસ ડ્રાઈવર D) થાઈલેન્ડમાં હોટેલ વેઈટર

19. હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?
A) બાબુ દેવનંદન ખત્રી B) ધર્મપાલ
C) અજ્ઞેય D) મૈથીલીશરણ ગુપ્ત

20. વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ના સ્થાપક કોણ હતા ?
A) બાબાસાહેબ આંબેડકર B) વીર સાવરકર
C) પૂ. ગુરુજી D) ડો. હેડગેવાર

21. દ્વિઘાત સમીકરણ $ax^2+bx+c = 0$નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ......નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું.
A) પાયથાગોરસ B) શ્રીધર આચાર્ય
C) આર્યભટ્ટ D) ભાસ્કરાચાર્ય

22. ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દૃશ્યમાન થાય છે?
A) વિશાળ દરિયાકિનારો B) સારા માર્ગો
C) ગૌહત્યા સંબંધી D) દારૂબંધી

23. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
A) ગાંધીજી B) જવાહરલાલ નેહરૂ
C) બાબાસાહેબ આંબેડકર D) ડો. રાજેન્દ્ર પ્રસાદ

24. વિશ્વની સૌપ્રથમ કીડની યુનિવર્સિટી ક્યા રાજ્યમાં નિર્માણ થવા જઈ રહી છે ?
A) રાજસ્થાન B) દિલ્હી C) મહારાષ્ટ્ર D) ગુજરાત

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

25. ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?
A) વડનગર B) અમદાવાદ C) વિસનગર D) મહેસાણા

26. ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?
A) રેંટિયા ચક્ર B) પરિવર્તન ચક્ર
C) સુદર્શન ચક્ર D) અશોક ચક્ર

27. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ?
A) મોર B) હંસ C) ચકલી D) કબૂતર

28. ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?
A) સરદાર વલ્લભભાઈ પટેલ B) રાધાકૃષ્ણન
C) જવાહરલાલ નેહરુ D) રાજાજી

29. ક્યા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે?
A) આમીર ખાન B) સલમાન ખાન
C) અમિતાભ બચ્ચન D) શાહરુખ ખાન

30. કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?
A) દેડકું B) ભૂંડ C) ઉંદર D) ગરોળી

31. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું ?
A) કેળું B) સફરજન C) નાળિયેર D) કેરી

32. ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?
A) લીલો-કેસરી-સફેદ B) સફેદ-લાલ-લીલો
C) સફેદ-લીલો-કેસરી D) કેસરી-સફેદ-લીલો

33. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું ?
A) હરણ B) હાથી C) વાઘ D) ગાય

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

34. 22 ઓક્ટોબર, 2015ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
A) મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ B) યોગગુરુ બાબા રામદેવ
C) વડાપ્રધાન નરેન્દ્ર મોદી D) રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

35. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું?
A) રાજકોટ B) અમરેલી C) અમદાવાદ D) વડોદરા

36. 'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ?
A) ભૂરો B) જુમો C) વેણુ D) રેણુ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

37. ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યા અપીલ કરી શકાય?
A) રાજ્ય સરકારને B) મુખ્ય સચિવને
C) નામદાર હાઈકોર્ટને D) ઉપરોક્ત તમામને

38. ક્યુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ?
A) મોર B) ફ્લેમિંગો
C) ગ્રેટ ઈન્ડીયન બસ્ટાર્ડ D) પોપટ

39. સ્માર્ટફોનમાં કઈ એપ્લીકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?
A) ટ્રુકોલર B) જી.પી.એસ. C) વોટ્સ એપ D) ફેસબુક

16)B, 17)A, 18)D, 19)A, 20)D, 21)B, 22)D, 23)D, 24)D, 25)A, 26)D, 27)A, 28)A, 29)C, 30)A, 31)D, 32)D, 33)C, 34)C, 35)D, 36)C, 37)C, 38)B, 39)B.

40. 'સત્યમેવ જયતે' સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?
A)ઈશોપનિષદ B)બ્રહ્મસુત્ર
C)ઉત્તર મીમાંસા D)માન્ડુક્ય ઉપનિષદ

41. રોમન લિપિમાં 'XD' લખીએ તો કેટલા થાય ?
A)490 B)49 C)4900 D)4.9

42. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?
A)શ્રી બાળાસાહેબ દેવરસ B)પૂજ્ય ગુરૂજી
C)શ્રી રજ્જુભૈયા D)પૂજ્ય ડૉ.હેડગેવાર

43. વજીર એટલે........
A)મંત્રી B)સૈનિક C)સંત્રી D)પ્રધાન

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

44. ATMનું આખું નામ શું છે ?
A)ઓટોમેટિક ટેલર મશીન B)ઓલ ટાઈમ મની
C)ઓટોમેટેડ ટેલર મશીન D)એની ટાઈમ મની

45. સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે ?
A)અઝીમ પ્રેમજી B)મુકેશ અંબાણી
C)રતન તાતા D)આદિત્ય બિરલા

46. એપ્રિલ 2015થી નવા નિયમ પ્રમાણે રેલવે રિઝર્વેશન ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ?
A)60 B)120 C)90 D)30

GPSC પેપર - 1 - 2017

47. નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એક્ટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતિ સમૂદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમૂદાયોને ઓળખો.
A)મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિન્ધી
B)મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિન્ધી અને બહાઈ
C)મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિન્ધી, બહાઈ અને જૈન
D)મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન

48. 1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી?
A)ભારત - યુ.એસ.એ. B)ભારત - સોવિયત યુનિયન
C)ભારત - ચીન D)ભારત - ઈઝરાયલ

GPSC પેપર - 2 - 2017

49. ગુજરાતમાં અનુચૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?
A)13 અને 27 B)13 અને 28 C)14 અને 25 D)15 અને 26

50. તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી"નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?
A)અનિતા દેસાઈ B)સુમિત્રા મહાજન
C)સ્મૃતિ ઈરાની D)જયા બચ્ચન

51. નીચેના પૈકી ક્યું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ?
A)સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ
B)ઈતિહાદ - જેટ એરવેઝ
C)એર એશિયા - ઈન્ડિગો
D)એર એશિયા - ટાટા સન્સ

52. મ્યાનમારનું નીચેના પૈકી ક્યું રાજ્ય રોહિંગીયા મુસ્લીમોનું વતનસ્થળ ગણાય છે ?
A)કાચિન B)કાયિન C)કોયાહ D)રાખિન

GPSC MAINS પેપર - 2 - 2016

53. વિશ્વનો સૌથી મોટો સીંગલ રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ (Single Roof Top Solar Power Plant) ક્યા આવેલો છે?
A)ન્યુયોર્ક, યુ.એસ.એ. B)પેરીસ, ફ્રાન્સ
C)ડેરાબાબા, પંજાબ, ભારત D)મનાલી, હિમાચલ પ્રદેશ, ભારત

PSI GK - 1/1/2017

54. Amazon.comનું મુખ્યાલય ક્યા છે ?
A)વોશિંગ્ટન B)ન્યુયોર્ક C)લંડન D)વિએના

55. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે?
A)ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરીયા
B)ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા
C)ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
D)ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી

PSI GK - 4-3/5-3/2017

56. નીચેનામાંથી ક્યા રાજ્યમાં ઈલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ છે?
A)કેરળ B)આંધ્રપ્રદેશ C)આસામ D)દિલ્હી

57. નમ્મા મેટ્રો તે ક્યા શહેરની મેટ્રો સેવા છે ?
A)હૈદરાબાદ B)કોલકાતા
C)વિશાખાપટ્ટનમ D)બેંગ્લુરૂ

58. ભારતના ક્યા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી ?
A)ઝારખંડ B)રાજસ્થાન C)ગુજરાત D)મધ્ય પ્રદેશ

40)D, 41)A, 42)D, 43)D, 44)C, 45)A, 46)B, 47)D, 48)B, 49)A, 50)B, 51)C, 52)D, 53)C,
54)A, 55)B, 56)A, 57)D, 58)C.

કોન્સ્ટેબલ - 23/10/2016

59. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ?

A) 2008 B) 1800 C) 1980 D) 440

60. એક નોટિકલ માઈલ બરાબર :

A) 1.85 કિ.મી. B) 1.61 કિ.મી. C) 1.65 કિ.મી. D) 1.4 કિ.મી.

કોન્સ્ટેબલ - 2015

61. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.

A) કલ્પના ચાવલા B) સુનિતા વિલિયમ્સ
C) લજ્જા ગોસ્વામી D) ગીત શેઠી

બિન સચિવાલય ક્લાર્ક - 2016

62. સહકારી બેંકો માટેનો કાયદો 'ધ રેગ્યુલેશન'(કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ?

A) 1968 B) 1966 C) 1969 D) 1967

63. આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘડાયેલ(TADA)ના કાયદાનું પૂરૂ નામ જણાવો.

A) Terrorist and Disruptive Activities (Prevention) Act
B) Terrorisam and Distructive Activities (Prevention) Act
C) Terrorism and Distruction Activities (Preventive) Act
D) Terrorist and Disruptive Activities (Preventive) Act

64. તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ?

A) 1948 B) 1956 C) 1952 D) 1962

65. ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

A) લોકવિચાર મંચ B) લોકભારતી
C) લોકવાણી D) લોકઅમૃત

66. FIR નું પુરુ નામ શું છે ?

A) First Investigation Report
B) First Information Report
C) First Information Record
D) First Investigation Record

67. કેન્દ્ર સરકારે પસાર કરેલ ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો.

A) Goods Sales Tax B) Goods and Service Tax
C) Goods Service Tax D) Goods and Sales Tax

GPSC પ્રિલિમ - 2001

68. ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

A) ભાવનગર યુનિવર્સિટી B) ઉત્તર ગુજરાત યુનિ.
C) કૃષિ યુનિવર્સિટી D) આયુર્વેદ યુનિવર્સિટી

69. આમાં નવું નામ કોને ન મળ્યું ?

A) કલકત્તા B) મદ્રાસ C) અમદાવાદ D) બોમ્બે

70. ઈ.સ.2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

A) રજત B) સુવર્ણ
C) હીરક D) આમાંનો એકપણ નહીં

71. પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

A) ઈન્દિરા ગાંધી B) મોરારજી દેસાઈ
C) લાલબહાદુર શાસ્ત્રી D) ગુલઝારીલાલ નંદા

72. "અભયઘાટ" કોની સમાધિ છે ?

A) ચૌધરી ચરણસિંહ B) ઈન્દિરા ગાંધી
C) મોરારજી દેસાઈ D) રાજીવ ગાંધી

73. આમાંથી પંડિત જવાહરલાલ નહેરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

A) નાસેર B) માર્શલ ટીટો
C) જહોન કેનેડી D) ગોર્બાચોવ

74. આમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ કોણ નથી ?

A) બિલ ક્લિન્ટન B) બિલ ગેઈટ્સ
C) જહોન કેનેડી D) આઈઝન હોવર

75. ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

A) સપ્તર્ષિ B) મંદિરમાં સ્થાપિત શિવલીંગ
C) હોકાયંત્ર D) આકાશમાં શનિ

76. "પોખરણ" કોની યાદ અપાવે છે ?

A) અણુપ્રયોગ B) રોકેટ લોન્ચિંગ
C) ભારત-પાક. સીમાયુદ્ધ D) જાન્યુ.2001નો ભૂકંપ

77. કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી?

A) મમતા બેનર્જી B) જયલલિતા
C) ચંદ્રાબાબુ નાયડુ D) લાલુપ્રસાદ યાદવ

78. આમાં કોણ બંધબેસતું નથી ?

A) સુવર્ણ B) સોનું C) કંચન D) કથીર

79. આમાં પંગત ભેદ કોણે કર્યો છે ?

A) કાકા B) ભત્રીજો C) ફોઈ D) વેવાઈ

80. આમાં કોનું નામ બંધબેસતું નથી ?

A) આનંદમયી મા B) રંગ અવધૂત
C) મોરારિબાપુ D) મુક્તાનંદ સ્વામી

81. લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

A) વિક્રમ શેઠ B) મેધા પાટકર
C) અરુંધતી રોય D) પ્રિયા તેંડુલકર

59)B, 60)A, 61)B, 62)B, 63)A, 64)C, 65)B, 66)B, 67)B, 68)B, 69)C, 70)B, 71)D, 72)C, 73)D, 74)B, 75)D, 76)A, 77)B, 78)D, 79)D, 80)C, 81)C.

82. VRS શું છે ?
A)વિડિયો રેકોર્ડીંગ સિસ્ટમ B)વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ
C)વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ D)આમાંનુ કશું નહીં

83. આમાંની કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે ?
A)VPP B)VIP C)VIIP D)VVIP

84. કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતાં 20°C જેટલી ઓછી છે. જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે ?
A)35°C B) 5°C
C)-5°C D)આમાનું કશું નહીં

85. ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?
A)પ્રા.નિરંજન દવે B)શ્રી વી.આર. મહેતા
C)ડૉ.પી.સી. વૈદ્ય D)ડૉ.એમ.એન. દેસાઈ

86. ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?
A)પંડિત જવાહરલાલ નેહરુ B)અટલ બિહારી વાજપેયી
C)દેવગૌડા D)વી.પી.સિંગ

87. આમાં કયું નામ જૂથમાં બેસતું નથી ?
A)ગોદરેજ B)બિરલા C)બજાજ D)નિરમા

88. આમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ?
A)ઈન્ફોસીસ B)ઈફકો C)વિપ્રો D)નાસ્કોમ

89 ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ?
A)પશ્ચિમ બંગાળ B)રાજસ્થાન
C)કચ્છ D)કારગિલ

90. આમાં ગરીબ કોને કહેવાય ?
A)દિન B)દીન C)વંચિત D)પછાત

91. "તૃણમુલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ?
A)બિહાર B)ઉત્તર પ્રદેશ C)કર્ણાટક D)પશ્ચિમ બંગાળ

92. વડાપ્રધાન તરીકે આઈ.કે. ગુજરાલ કોના અનુગામી બન્યા ?
A)અટલ બિહારી વાજપેયી B)દેવગૌડા
C)નરસિંહરાવ D)ચંદ્રશેખર

93. કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?
A)આવક વેરો B)કસ્ટમ ડયુટી
C)એક્સાઈઝ ડયુટી D)એસ્ટેટ ડયુટી

94. બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે ?
A)પોલાદ B)એલ્યુમિનિયમ C)જસત D)ત્રાંબું

95. આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?
A)સતીશ ગુજરાલ B)એમ.એફ. હુસેન
C)મૃણાલ સેન D)રવિશંકર રાવળ

96. આમાં તબલાના ખેરખાં કોણ ?
A)પંડિત રવિશંકર B)પંડિત જશરાજ
C)અલ્લારખા ખાન D)બિસ્મિલ્લાખાન

97. આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?
A)ખુશવંતસિંઘ B)આર.કે. નારાયણ
C)નિરાદ ચૌધરી D)સલમાન રશ્દી

98. "કસ્ટમ ડયુટી" એટલે ?
A)કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
B)બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
C)માલના વેચાણ વખતે લેવાતો કર
D)પરદેશથી આયાત કરેલા માલ પરની ડયુટી

99. સૌથી મોટી સંખ્યા કઈ ?
A)0.1 B)0.01 C)1.0 D)1.21

100. ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ ?
A)ઈન્દિરા ગાંધી B)નઝમા હેપતુલ્લા
C)સુચેતા કૃપલાણી D)આમાંથી એકેય નહીં

101. આમાં વર્ગભેદ કોણ કરે છે ?
A)ગ્રામ B)કિલોગ્રામ C)મિલીગ્રામ D)ટેલિગ્રામ

102. આમાં કોણ બહુમતી જૂથની બહારનું છે ?
A)કોડિયું B)બલ્બ C)ફાનસ D)મીણબત્તી

103. કોણ જુદું તરી આવે છે ?
A)ઢોલક B)હારમોનિયમ C)તબલા D)નગારું

104. શિવ આ નામે ઓળખાતા નથી.
A)મહાદેવ B)શંકર C)ધૂર્જટિ D)નારાયણ

105. તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે ?
A)બુધ B)મંગળ C)ગુરૂ D)શનિ

106. જી.પી.એસ.સી. એટલે પ્રચલિત સમાજમાં...
A)ગુજરાતની પ્રાયમરી એન્ડ સેકન્ડરી સર્ટીફીકેટ
B)ગુજરાત પોલ્યુશન સ્ટેટ કન્ટ્રોલ
C)ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
D)જનરલ પોલીસ સિલકશન કમિટિ

GPSC પ્રિલિમ - 2007

107. મુંબઈ કરતાં લંડનનો સમય પાંચ કલાક પાછળ છે. લંડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?
A)સાંજના છ B)બપોરના બે C)બપોરના ત્રણ D)રાત્રે આઠ

108. 63 મિલિમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ?
A)અઢી ઈંચ B)બે ઈંચ C)ત્રણ ઈંચ D)દોઢ ઈંચ

109. POW એટલે શું ?
A)પેન્શન ઓફ વોર B)પાવર ઓફ વોર્ડ
C)પ્રિઝનર ઓફ વોર D)આમાંનું કંઈ જ નહીં

110. અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ?
A)પાસપોર્ટ ઓફિસ B)ઈન્ડો-અમેરિકન સોસાયટી
C)આપણા વિદેશ મંત્રાલયમાંથી D)અમેરિકન કોન્સોલેટ

82)B, 83)A, 84)C, 85)C, 86)C, 87)D, 88)B, 89)D, 90)B, 91)D, 92)B, 93)D, 94)B, 95)B, 96)C,
97)B, 98)D, 99)D, 100)D, 101)D, 102)B, 103)B, 104)D, 105)D, 106)C, 107)C, 108)A, 109)C, 110)D.

111. એક મિલિયન એટલે શું થાય ?
A) એક લાખ B) એક કરોડ C) પચાસ લાખ D) દસ લાખ

112. 'કરાટે'ને ક્યા દેશ સાથે સંબંધ છે ?
A) ચીન B) જાપાન C) કોરિયા D) તાઈવાન

113. POK નો અર્થ શું છે ?
A) પ્રિન્સિપલ ઓ કરાટે B) પીપલ ઓફ કોરિયા
C) પાર્ટી ઓફ કાશ્મીર D) પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર

114. એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટિગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?
A) 35 B) 45 C) 40 D) 38

115. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?
A) નંદિની સતપથી B) સુચેતા કૃપલાણી
C) જયલલિતા D) માયાવતી

116. યુરો ક્યા દેશનું ચલણ છે ?
A) અમેરિકા B) ઈંગ્લેન્ડ
C) બ્રાઝિલ D) કોઈ પણ એક દેશનું નહીં

117. વોલમાર્ટ શું છે ?
A) ઈંગ્લેન્ડના ઉદ્યોગપતિ B) જાણીતા બિલ્ડર
C) એક વિશાળ સ્ટોર D) ફર્નિચરની દુકાન

118. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ?
A) ઈન્દોર B) ભોપાલ C) જબલપુર D) ગ્વાલિયર

119. જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય?
A) ઉત્તર B) પૂર્વ C) પશ્ચિમ D) દક્ષિણ

120. 'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના ક્યા નાટક પર આધારતિ છે?
A) ઓથેલો B) મેકબેથ C) હેમલેટ D) કિંગ લિયર

121. જવાહરલાલ નેહરુનું અવસાન ક્યા વર્ષમાં થયું હતું ?
A) 1965 B) 1962 C) 1964 D) 1963

122. શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો.
A) એડમંડ હિલેરી B) જહોન હંટ
C) એરીક શિપ્ટન D) મેલોરી

123. 'અલ-જઝીરા' શું છે ?
A) સમાચારપત્ર B) એક ટાપુ
C) એક વહાણ D) ટી.વી.ચેનલ

124. ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
A) 14 જુલાઈ 1919 B) 14 એપ્રિલ 1905
C) 14 મે 1889 D) 14 એપ્રિલ 1891

125. લક્ષ્મી મિત્તલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ?
A) પિત્તળ B) પેટ્રોલ C) લોખંડ D) સમાજસેવા

126. ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?
A) 15 ડિસેમ્બર B) 30 જાન્યુઆરી
C) 27 મે D) 31 ઑક્ટોબર

127. મરીના બીચ ક્યાં આવ્યો છે ?
A) મુંબઈ B) ચેન્નાઈ C) ગોવા D) કલકત્તા

GPSC પ્રિલિમ - 2014

128. 'સોય-દોરા' અને 'ફીરકી' શ્રેણીના દાવ ક્યા વ્યાયામનો ભાગ છે?
A) મલખમ B) જૂડો C) ખો-ખો D) લેઝિમ

129. સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી ક્યા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
A) શ્રી અર્જુનસિંહ B) શ્રી સામ પિત્રોડા
C) ડૉ. નંદન નીલેકણી D) શ્રી કપિલ સિબ્બલ

130. રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?
A) indianrailwayonline.co.in
B) indianrailway.nic.in
C) indianrail.gov.in/pnr_Enq.html
D) irctc.co.in

PSI ખાતાકીય - 23/04/2017

131. ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી ક્યો રોગ ફેલાય છે ?
A) ટાઈફોઈડ અને કોલેરા B) હીપેટાઈટીસ
C) પોલિયો D) ઉપરોક્ત તમામ

132. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના ક્યા દિવસે મનાવવામાં આવે છે ?
A) 1લી મે B) 31 માર્ચ
C) 26 જાન્યુઆરી D) 31 ડિસેમ્બર

133. ખુશ્બુ ગુજરાત કી- જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ ક્યા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?
A) મત્સ્ય ઉદ્યોગ B) ઘેટા અને ઊન
C) ડેરી ઉદ્યોગ D) પ્રવાસન ઉદ્યોગ

134. મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ ક્યા નામે ઓળખાય છે?
A) શક્તિસ્થલ B) રાજઘાટ C) અભયઘાટ D) શાંતિવન

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

135. 'અર્જુન' વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે?
A) વાત અને કફ દૂર કરે B) હૃદય રોગની સારવાર
C) ચામડી - દાંત - પેઢા ના રોગો માટે
D) શરદી - ઉધરસ - તાવ માટે

136. 'સૂંઠ' ક્યા છોડમાંથી બનાવવામાં આવે છે?
A) અશ્વગંધા B) અરડૂસી C) આદુ D) અઘેડો

137. 'ત્રિફળા' ઔષધિમાં ક્યા વૃક્ષનું ફળ વપરાય છે?
A) આમળા B) આદુ C) મીઠી આવળ D) પુવાડ

111)D, 112)B, 113)D, 114)A, 115)B, 116)D, 117)C, 118)B, 119)D, 120)A, 121)C, 122)A, 123)D, 124)D, 125)C, 126)A, 127)B, 128)A, 129)B, 130)D, 131)D, 132)A, 133)D, 134)C, 135)B, 136)C, 137)A.

138. કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે?
A)વરુ B)જંગલી કૂતરો C)ઝરખ D)ગીધ

139. કયા સસ્તન પ્રાણીને ચાર ઢીંચણ હોય છે?
A)ગાય B)હાથી C)ભેંસ D)સાબર

140. સિંહ જયારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય ?
A)પ્રાઈડ B)ગ્રુપ C)કલસ્ટર D)માસ

141. ટાઈગોન (Tigon) શું છે?
A)સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી
B)વાઘ અને માદા-દિપડા દ્વારા પેદા થયેલ પ્રાણી
C)વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
D)દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી

142. કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે?
A)ગરૂડ B)કાળો કોશી C)સમડી D)ઘુવડ

143. મધપૂડાની આડપેદાશ કઈ છે?
A)ગ્રીઝ B)વિટામીન C)મીણ D)શર્કરા

144. બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?
A)11 કલાક અને 25 મિનિટ B)12 કલાક અને 05 મિનિટ
C)11 કલાક અને 35 મિનિટ D)12 કલાક અને 25 મિનિટ

145. નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે?
A)નાગકેસર B)વડ C)સીતાફળ D)હંસરાજ

146. જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે?
A)સિમલા B)ત્રિવેન્દ્રમ C)દેહરાદૂન D)અલમોડા

147. પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દુષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે?
A)ક્લોરોફ્લોરોકાર્બન B)ડાયક્લોફીનેક (Diclofenac)
C)પેરાસીટામોલ (Paracetamol) D)રોગાર

148. નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજય પક્ષી છે?
A)સુરખાબ B)શ્યામગરૂડ C)મોર D)ઘોરડ

149. જળઘોડો કયા પ્રકારનું પ્રાણી છે?
A)સરીસૃપ B)સસ્તન C)ઉભયજીવી D)મત્સ્ય

PSI/ASI GK - 2/5/2015

150. પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે ?
A)નરસિંહ મહેતા B)રાજા હરિશચંદ્ર
C)ઉપર ગગન વિશાળ D)પુંડલિક

151. શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?
A)એકવીનો B)ગોલ્ડામાયર
C)શ્રીમતી શિરીમાઓ ભંડાર નાઈકે
D)શ્રીમતી નેવીન

GPSC Class-1 - 2016

152. વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ દરેક ધારાસભ્યશ્રીના મતવિસ્તાર માટે કેટલી રકમ પ્રતિ વર્ષ અલગ અલગ રીતે પૂરી પાડવામાં આવે છે ?
A)રૂા. 50 લાખ B)રૂા. 100 લાખ
C)રૂા. 150 લાખ D)રૂા. 200 લાખ

153. ભારતમાં સૌ પ્રથમ મેટ્રો રેલ સેવા કયા શહેરમાં શરૂ થઈ હતી?
A)કલકત્તા B)દિલ્હી C)મુંબઈ D)જયપુર

GPSC Class - 2 - 29/1/2017

154. અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તિને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું?
A)ઈ.સ.1928 B)ઈ.સ.1930 C)ઈ.સ.1935 D)ઈ.સ.1947

GPSC Class-1 - 15/01/2017

155. હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એકટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો?
A)વિધવા પુનઃલગ્ન કાયદો B)હિન્દુ સ્ત્રી વારસાધારો
C)બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
D)હિન્દુ સિવિલ મેરેજ એકટ

156. Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે?
A)નેપાળ B)ભુતાન
C)શ્રીલંકા D)બ્રહ્મદેશ (મ્યાનમાર)

GPSC Class-1 - 15/01/2017

157. તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું .... ગણાય.
A)મરજિયાત B)ફરજિયાત
C)અનિશ્ચિત D)અનુકૂળતા અનુસાર

158. ટ્રાયબલ અફેર્સ મિનિસ્ટ્રી ની રચના ક્યારે થઈ ?
A)1999 B)2000 C)2001 D)2002

159. મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે ?
A)CII B)CIC C)SEWA D)SPCA

138)C, 139)B, 140)A, 141)C, 142)B, 143)C, 144)D, 145)D, 146)C, 147)B, 148)A, 149)D, 150)A, 151)C, 152)B, 153)A, 154)B, 155)C, 156)A, 157)B, 158)A, 159)C.

160. સ્વાતંત્ર્યોત્તરકાળ (1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?
A) સમાજ કલ્યાણ બોર્ડ B) સમાજ સુરક્ષા મંડળ
C) ઉત્કર્ષ બોર્ડ D) મહિલા વિકાસ મંડળ

161. ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?
A) 11 મી નવેમ્બર, 2000 B) 11 મી ડિસેમ્બર, 2014
C) 11 મી નવેમ્બર, 2004 D) 11 મી ડિસેમ્બર, 2000

162. ધ નેશનલ પોલીસી ઓન એજ્યુકેશન (NPE)ની રચના કઈ સાલમાં થઈ હતી.
A) 1986 B) 1987 C) 1988 D) 1990

163. ભારતીય ફોજદારો એટલે ?
A) ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ B) ઈન્ડિયન પીનલ કોન્સ્ટિટ્યુશન
C) ઈન્ડિયન પીનલ કોડ D) ઈન્ડિયન પનિશમેન્ટ લૉ

164. નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?
A) ગ્રામ પંચાયત સભ્ય B) સરપંચ
C) મામલતદાર D) તલાટી

165. ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ ક્યા આર્ટીકલમાં કરેલ છે ?
A) 366 (25) B) 366 (26) C) 366 (27) D) 366 (28)

166. બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી ?
A) ગુજરાત B) જમ્મુ અને કાશ્મીર
C) કેરળ D) મેઘાલય

167. એટ્રોસીટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન.........
A) અર્ધ સત્ય છે. B) સંપૂર્ણ સત્ય છે.
C) ઉપરોક્ત પૈકી એક પણ નહીં D) અસત્ય છે.

168. ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી?
A) 2000 B) 2003 C) 2005 D) 2010

169. એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?
A) વડી અદાલત B) સર્વોચ્ચ અદાલત
C) કોઈ પણ નહીં D) સેશન્સ અદાલત

170. લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ?
A) 11 B) 182 C) 26 D) 37

171. અનુ. જાતિ / અનુ. જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના ક્યા રાજ્યને બાકાત કરે છે ?
A) જમ્મુ અને કાશ્મીર B) ગુજરાત
C) મધ્ય પ્રદેશ D) મહારાષ્ટ્ર

172. નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ?
A) સેવા રૂરલ B) સદગુરુ સેવા ટ્રસ્ટ
C) વેડછળ પ્રદેશ સેવા સમિતિ D) ગ્રામ સેવા ટ્રસ્ટ

GPSC Class-1 - 15/01/2017

173. IEC નું પૂરું નામ.........
A) ઈન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનીકેશન
B) ઈન્ટીગ્રેટેડ એજ્યુકેશન કમીશન
C) ઈન્ફોરમેશન એજ્યુકેશન કાઉન્સેલીંગ
D) ઈન્ટરમીટન્ટ એજ્યુકેશન કમીશન

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

174. નીચેના પૈકી સૌથી લાંબુ ક્યું છે ?
A) એક કિલોમીટર B) એક સેન્ટીમીટર
C) એક ડેકામીટર D) એક ટેટ્રામીટર

GPSC Class - 2 - 16/04/2017

175. નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે?
1) નેશનલ સિક્યુરીટી ગાર્ડ (NSG)
2) બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
3) ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
A) 1 અને 2 B) 2 અને 3
C) 1, 2 અને 3 D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

176. 'સાઉથ સૂદાન'ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે ને કેટલામું સભ્ય છે?
A) 191 B) 193 C) 195 D) 197

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

177. ધરતી પરનું સૌથી ઝડપથી દોડી શકતું પ્રાણી ક્યું છે ?
A) ચિત્તો B) સિંહ C) માણસ D) હરણ

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

178. વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય?
A) 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
B) 100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
C) 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
D) 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ

179. નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે?
A) જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડીયર
B) જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડીયર
C) જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડીયર
D) જનરલ, લેફ્ટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડીયર

160)A, 161)C, 162)A, 163)C, 164)C, 165)A, 166)B, 167)D, 168)C, 169)C, 170)C, 171)A, 172)A, 173)A, 174)D, 175)C, 176)B, 177)A, 178)D, 179)B.

GPSC Class - 1 - 28/01/2017

180. વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે?
A)શ્રીમતી ઈન્દિરા ગાંધી B)શ્રીમતી શિરિમાવો ભંડારનાયક
C)શ્રીમતી માર્ગારેટ થેચર D)કુ.બેનઝીર ભુટ્ટો
181. વેલિંગ્ટન ક્યા દેશની રાજધાની છે?
A)નોર્વે B)નાઈઝીરીયા
C)ન્યૂઝીલેન્ડ D)નેધરલેન્ડ (હોલેન્ડ)
182. જગતમાં સૌપ્રથમ મુદ્રણકળાની શોધ ક્યા દેશે કરી હતી?
A)ભારત B)યુ.એસ.એ. C)યુ.કે D)ચીન

નાયબ ચિટનીશ - 02/06/2015

183. 'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નીભાવી છે?
A)કરિના કપૂર B)પ્રિયંકા ચોપરા
C)આલિયા ભટ્ટ D)પરિણીતી ચોપરા
184. કિરણ મજમુદાર ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
A)રમતજગત B)ફિલ્મ
C)રાજકારણ D)કોર્પોરેશન કંપની
185. રશિયન વાર્તા 'વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ....છે?
A)સાવરિયા B)ક્વિન C)રામ-લીલા D)રોકસ્ટાર

નાયબ ચિટનીશ - 05/02/2017

186. ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?
A)સલમાન ખાન B)અમિતાભ બચ્ચન
C)અભિષેક બચ્ચન D)બાબા રામદેવ

GPSC Class - 2 - 12/02/2017

187. વિશ્વ વ્યાપાર સંગઠન કરાર ક્યારથી અમલમાં આવેલ છે?
A)તા.1-1-1994 B)તા.1-1-1995
C)તા.1-1-1996 D)તા.1-1-1998
188. NSGM નું પુરું નામ શું છે?
A)નેશનલ સ્માર્ટ ગ્રીડ મીશન
B)નેશનલ સિક્યોરીટી ગાર્ડસ મિલીટરી
C)ન્યૂ સ્માર્ટ ગ્રીડ મીશન
D)ઉપર પૈકી એકપણ નહી

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

189. માનવ અધિકારોની ઘોષણા ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
A)1948 B)1949 C)1950 D)1951
190. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ક્યા વર્ષમાં લાગુ થયો હતો ?
A)1978 B)1988 C)1998 D)2008
191. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો ?
A)1990 B)1995 C)1993 D)1992
192. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?
A)સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
B)પછાત વર્ગના સંસદસભ્ય
C)કેન્દ્ર સરકારના અગ્રસચિવ
D)જાણીતા સમાજ વિજ્ઞાનસ
193. મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા.............અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.
A)500 મીટર B)1000 મીટર C)1500 મીટર D)2000 મીટર
194. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિઘ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?
A)લેન્ડ મેપીંગ B)સ્કૂલ મેપીંગ
C)ડિસાસ્ટર મેપીંગ D)ડિસાસ્ટર મેનેજમેન્ટ
195. મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?
A)1 એપ્રિલ, 2010 B)1 એપ્રિલ, 2009
C)1 જૂન, 2010 D)1 જૂન, 2009
196. રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ?
A)ડિસ્ટ્રીક્ટ કોર્ટ B)હાઈકોર્ટ
C)સેશન્સ કોર્ટ D)તાલુકા કોર્ટ
197. સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ)માં સમાજશાસ્ત્ર વિષયના ક્યા સભ્ય હતા ?
A)સૈયદ હમીદ B)રાકેશ બસંત
C)ટી.કે.ઓમેન D)રજીન્દર સચર
198. 2014માં ક્યા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?
A)પારસી B)જૈન C)ખ્રિસ્તી D)શિખ
199. શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?
A)ઘરેલું હિંસા અટકાવવા માટે B)બાળ લગ્નો અટકાવવા માટે
C)સ્ત્રી સશક્તિકરણ માટે D)છૂટાછેડા અટકાવવા માટે

180)B, 181)C, 182)D, 183)B, 184)D, 185)A, 186)B, 187)B, 188)A, 189)A, 190)B, 191)C, 192)A, 193)B, 194)B, 195)A, 196)B, 197)C, 198)B, 199)B.

GPSC Class - 2 - 5/3/2017

200. લેડી વીથ લેમ્પ (Lady with Lamp) તરીકે કોણ પ્રખ્યાત છે?
A)કવીન વીકટોરીયા B)ફ્લોરેન્સ નાઈટીંગેલ
C)સરોજીની નાયડુ D)માદમ ભીખાજી કામા

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

201. એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લીટર પાણી વપરાય છે ?
A)30 B)35 C)40 D)25
202. મરાલ - એટલે કયું પક્ષી ?
A)બાજ B)મોર C)કબૂતર D)હંસ
203. પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?
A)નારદ B)કામદેવ C)વિશ્વકર્મા D)કાર્તિકેય

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

204. ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?
A)સત્ય વિજયતે B)સત્યમ, શિવમ, સુંદરમ્
C)સત્યમેવ જયતે D)જય સચ્ચિદાનંદ
205. કઈ ઋતુમાં વૃક્ષોને નવાં પાંદડા ફૂટે છે ?
A)વર્ષા B)શરદ C)શિશિર D)વસંત
206. 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ?
A)મુંબઈ B)દિલ્હી C)કલકત્તા D)ચેન્નાઈ
207. ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
A)ડૉ.રાજેન્દ્રપ્રસાદ B)પં.જવાહરલાલ નહેરુ
C)ડૉ.બાબાસાહેબ આંબેડકર D)ડૉ.રાધાકૃષ્ણન
208. ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ?
A)યતકિંચિત B)ગુજરાત C)દ્રષ્ટિ D)આરંભ
209. 'વલ્કલ' એટલે શું ?
A)રેશમી વસ્ત્ર B)ઝીણું વસ્ત્ર
C)ખાદીનું વસ્ત્ર D)ઝાડની છાલનું વસ્ત્ર
210. 'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?
A)સ્ટીફન હોકીંગ B)આઈનસ્ટાઈલ
C)ન્યુટન D)જ્હોન કેટલર
211. BISનું પુરું નામ............ છે.
A)બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ
B)બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
C)બાયપાસ ઈન સીટી
D)બોબે ઈન્ટેલીજન્સ સેલ
212. બેઈજીંગ કયા દેશની રાજધાની છે ?
A)શ્રીલંકા B)નેપાળ C)બ્રિટન D)ચીન

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

213. 1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ?
A)સાણંદ B)કલોલ C)દહેગામ D)બારજેડી
214. નીચેના પૈકી ક્યું ગરમ વાતાવરણનું ફળ છે ?
A)કેરી B)કેળાં C)પાઈનેપલ D)સફરજન
215. નીચેનામાંથી કઈ વહેલી પાકતી આંબાની જાત છે ?
A)બોમ્બે ગ્રીન B)આલફાન્ઝો C)ગોપાલભોગ D)આ બધા જ
216. ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્દભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?
A)ટેક્ષચર B)સ્ટ્રકચર
C)ટીલ્થ D)આમાંથી કોઈ નહીં
217. પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ?
A)10 ટકા B)30 ટકા C)50 ટકા D)80 ટકા
218. કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?
A)જમીન સંરક્ષણ B)ભેજ સંરક્ષણ
C)(A) અને (B) બન્ને D)નિંદણ નિયંત્રણ
219. જમીનમાંથી છોડને સૌથી વધુ લભ્ય ફોસ્ફરસ ક્યા સ્વરૂપે મળે છે?
A)$H_2PO_4^-$ B)HPO_4^{-2} C)PO_4^{-3} D)PO_4^{+3}
220. નીચેના પૈકી કયો પાક લોહ (Fe) તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ?
A)મકાઈ B)જુવાર C)મગફળી D)આ બધા જ
221. કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે ક્યા ચિહ્નો જોવા મળે છે ?
A)પાન પીળા પડવાં B)પાન લાલ થવાં
C)પાન ખરી પડવાં D)આમાંથી કોઈ નહીં
222. નીચેના પૈકી ક્યા પાકમાં લીલા પડવાશનો સૌથી સારો પ્રતિભાવ જોવા મળે છે ?
A)કપાસ B)મગફળી C)ડાંગર D)ઘઉં
223. ડાંગરના ધરૂવાડિયામાં ક્લોરોસીસ શાની ઊણપને લીધે થાય છે?
A)જસત તત્વ B)બોરોન તત્વ
C)લોહ તત્વ D)કોપર તત્વ
224. દાદરગોટી ક્યા પાક સાથે સંકળાયેલ છે ?
A)ડાંગર B)બાજરા C)મકાઈ D)જુવાર
225. જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા ક્યા નામે ઓળખાય છે ?
A)વોટર હાર્વેસ્ટિંગ B)ડ્રેનેજ
C)રન ઓફ D)વોટર શેડ
226. નીચેના પૈકી કઈ પાક પદ્ધતિમાં વધારાનો નાઈટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?
A)ડાંગર - ઘઉં B)બાજરી - ઘઉં
C)મકાઈ - ઘઉં D)મગફળી - તુવેર

200)B, 201)A, 202)D, 203)C, 204)C, 205)D, 206)A, 207)A, 208)A, 209)D, 210)A, 211)B, 212)D, 213)D, 214)A, 215)D, 216)C, 217)B, 218)C, 219)A, 220)D, 221)B, 222)C, 223)C, 224)D, 225)B, 226)D.

227. નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?
A)સૌથી નીચેના B) મધ્યમના
C)સૌથી ઉપરના D) આ બધા જ

228. અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે ?
A)આંબા B)જામફળ C) દાડમ D) દ્રાક્ષ

229. પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?
A)પીડબ્લ્યુપી B) ફીલ્ડ કેપેસીટી
C)એડહેઝન D) કોહેઝન

230. નીચેના પૈકી કઈ ખેડૂતોની સંસ્થા છે ?
A)એફ.સી.આઈ. B) ઈફકો
C)એગ્રો સર્વિસ સેન્ટર D) શ્રીરામ ફર્ટિલાઈઝર

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

231. કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ?
A) ફૂટબોલ B) આઈસ હોકી C) બેઝબોલ D) વોલીબોલ

232. ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ?
A) દિલ્હી B) અમદાવાદ C) સુરત D) ગાંધીનગર

233. ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
A) ઈ.સ.1960 B) ઈ.સ.1951 C) ઈ.સ.1947 D) ઈ.સ.1948

234. NFDC(નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન) .... ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે.
A) કાપડ B) ખાંડ C) ફિલ્મ D) સ્ટીલ

GSSSB મિકેનિક - 2017

235. સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?
A)રાહત કમિશનર B) CEO-GSDMA
C)મુખ્ય સચિવ D) રાહત નિયામક

મુખ્ય સેવિકા - 8/1/2017

236. 'મામલતદાર, તબિયત, આબેહૂબ'-મૂળ કઈ ભાષાના શબ્દો છે?
A) મરાઠી B) અંગ્રેજી C) અરબી D) કન્નડ

237. કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે ?
A) કીંગફીશર B) મોર C) ફ્લેમિંગો D) વેજી કલ્ચર

238. અંક ગણતરી, નાનું- મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?
A) ભાષા વિકાસ B) બૌદ્ધિક વિકાસ
C) શારીરિક વિકાસ D) સામાજિક વિકાસ

વિસ્તણ અધિકારી - 7/1/2017

239. "ઓપરેશન ફલડ"કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?
A) દૂધ ઉત્પાદન B) તેલીબિયાં ઉત્પાદન
C) કપાસ ઉત્પાદન D) કઠોર ઉત્પાદન

240. સહકારી આગેવન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?
A) પોરબંદર B) જસદણ C) ભાવનગર D) પાલનપુર

241. ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?
A) ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
B) અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.
C) તલારડી સેવા સહકારી મંડળી લિ.
D) ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.

242. સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?
A) તાલુકા વિકાસ અધિકારી B) રજિસ્ટ્રાર
C) કલેક્ટર D) મામલતદાર

243. સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?
A) પેટા નિયમો B) ઠરાવો
C) નિયમો D) એક પણ નહીં

244. સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ?
A) 10 B) 12 C) 25 D) 15

245. સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ?
A) સાત B) ત્રણ C) એક D) પાંચ

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

246. યોગ્ય રીતે જોડકાં જોડો.

P) રાજસ્થાન	H)રાયપુર
Q)ઉત્તરાખંડ	I) જયપુર
R)અરુણાચલ પ્રદેશ	J) ઈટાનગર
S) છત્તીસગઢ	K)દહેરાદુન

A)P-I, R-H, S-J, Q-K B) R-I, Q-K, P-J, S-H
C) S-K, P-I, R-J, Q-H D) Q-K, R-J, P-I, S-H

247. "રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?
A)ત્રિપુરા B)તેલંગણા C) ઉત્તરાખંડ D)તામિલનાડુ

248. વિદેશી ચલણનો સંગ્રહ અને દાણચોરીની પ્રવૃત્તિને અટકાવવાનો કાયદો (COFE POSA)નું પુરું નામ જણાવો.
A)Conserving of Foreign Exchange and Preventing of Smuggling Activities.
B) Conservation of Foreign Exchange and Preventive of Smugglur Activity.
C) Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities.
D)Conserving of Foreign Exchange and Preventing Smuggling Activity.

227)A, 228)B, 229)B, 230)B, 231)B, 232)D, 233)A, 234)C, 235)C, 236)C, 237)C, 238)B, 239)A, 240)A, 241)A, 242)B, 243)A, 244)A, 245)A, 246)D, 247)B, 248)C.

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

249. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ક્યા વર્ષમાં કોલકાતામાં સ્થપાયેલ ?
A) 1931 B) 1915 C) 1913 D) 1951

250. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ?
A) 1992 B) 1986 C) 1976 D) 1978

GSSSB હેડ કલાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

251. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?
A) જોરહટ B) બેંગલોર C) કોલકાતા D) નવી મુંબઈ

252. યોગ્ય રીતે જોડકો જોડો.
H) મણિપુર 1) હૈદરાબાદ
I) મેઘાલય 2) દીસપુર
J) તેલંગણા 3) શિલોંગ
K) આસામ 4) ઈમ્ફાલ
A) I-1, K-2, J-3, H-4 B) J-1, H-4, I-3, K-2
C) H-4, J-1, I-2, K-3 D) K-2, I-3, J-4, H-1

TET-II -2017

253. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ક્યુ સામયિક પ્રકાશિત થાય છે ? - બાળવિશ્વ
254. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે તાજેતરમાં રચાયેલ સમિતિના અધ્યક્ષ કોણ છે ? - કે.કસ્તુરીરંગન
255. 'માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી' એવું કહેનાર કોણ હતા ? - સ્વામી વિવેકાનંદ
256. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળનાર પ્રથમ ભારતીય કોણ હતા ? - વિજ્યાલક્ષ્મી પંડિત
257. ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યા બને છે ? - હોશંગાબાદ
258. ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારી કોણ હતી? - પ્રિતી સેનગુપ્તા

HTAT - 2015

259. ATMનું આખું નામ શું છે? : ઓટોમેટેડ ટેલર મશીન
260. સરફરોશી કી તમન્ના અબ હમારે દીલ મે હે ના લેખક કોણ છે? : રામપ્રસાદ બિસ્મીલ

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

261. ગુજરાત મૂલ્ય વર્ધીત વેરો, 2003નો અમલ તા............થી શરૂ થયો છે. - 1-4-2006
262. દસ લાખ એટલે કેટલા મિલિયન ? - 1
263. ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ? - વાર્ષિક નાણાંકીય પત્રકને

કલાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

264. પુરાણો ''મેસોપોટેમિયા'' પ્રદેશ હાલ ક્યા દેશના નામે ઓળખાય છે ? - ઈરાક
265. OBOR યોજના ક્યા દેશની છે ? - ચીન
266. ''બાહુબલી'' ચલચિત્રના દિગ્દર્શક કોણ છે ? - રાજા મૌલિ
267. ફિલ્મ કલાકાર સ્વર્ગસ્થ વિનોદખન્નાની પ્રથમ ફિલ્મ કઈ હતી ? - મનકા મીત
268. ''એરોપ્લેન ઓન ટ્રેક'' તરીકે કઈ ટ્રેન ગણાય છે ? - તેજસ એક્સપ્રેસ

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 2012

269. ક્યા દેશની કંપની દ્વારા ગુજરાતમાં સ્પોર્ટ્સ વિલેજની સ્થાપના કરવામાં આવનાર છે ? - ફ્રાન્સ
270. પુષ્પમાં આવેલ ફૂલમણી અન્ય ક્યા નામે ઓળખાય છે ? - દલચક

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર - 2012

271. વસ્તી (લોક સંખ્યા)ના બાબતે વિશ્વમાં ભારતનો ક્રમાંક ક્યો ? - બીજો
272. ભારતની વસ્તી વિશ્વની વસ્તી લગભગ કેટલા ટકા છે ? - 17
273. ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ ? - TRAI
274. અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે - વિનિમય મૂલ્ય
275. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્ષ GVAT Act 2003' ગુજરાતમાં કઈ સાલમાં અમલમાં આવ્યો ? - 2006

પોલીસ કોન્સ્ટેબલ - 2012

276. યુ.એસ.એ.ની રાજધાની કઈ છે? - વોશીંગ્ટન ડીસી
277. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? - ચાર
278. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ક્યા રાજ્યમાં આવેલી છે? - ઉત્તરપ્રદેશ
279. પોખરણ ક્યા રાજ્યમાં આવેલું છે? - રાજસ્થાન
280. અમૃતસર : પંજાબ, ગુડગાંવ : હરીયાણા, ભોપાલ : મધ્યપ્રદેશ, પૂણે : મહારાષ્ટ્ર
281. માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે? - 30

GSSSB જુનિયર આસિસ્ટન્ટ - 2017

282. જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દૃષ્ટિકોણ રજૂ કર્યો..... - ફ્રેડરીક ટેલર
283. કઈ પદ્ધતિમાં તાલીમાર્થીને સૈદ્ધાંતિક શિક્ષણ તેમ જ વહેવારૂ તાલીમ આપવામાં આવે છે? - ઈન્ટર્નશિપ તાલીમ

249)A, 250)B, 251)C, 252)B.

284. ગુજરાત રાજયની ખેલકૂદ નીતિ-2016 અન્વયે આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યુટની જેમ મિશન ઓલિમ્પિકના ભાગ રૂપે શેની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે? - **ગુજરાત પોલીસ સ્પોર્ટ્સ યુનિટ - સેન્ટર ઓફ એક્સલન્સ**

285. ભારતમાં FRBM Act ક્યા વર્ષથી અમલમાં આવ્યો છે? - **2003**

પ્રોબેશન ઓફિસર - 2016

286. સોશ્યલ ડાયગ્નોસિસ પુસ્તકના લેખક કોણ છે ? - **મેરી રીચમંડ**

287. 'ર્રુર્બેનાઈઝેશન'ની સૌપ્રથમ સમજ કોણે આપી હતી ? - **સી.જે.ગાલ્પીન**

288. ....એ પ્રેરણાઓનો શ્રેણી ક્રમનો સિદ્ધાંત આપ્યો છે. - **મેસ્લો**

289. ભારતમાં સૌથી વધુ ભીલ વસતી ક્યા રાજયમાં છે ? - **મધ્ય પ્રદેશ**

290. RTE એટલે શું ? - **Right to Education**

291. ઈન્ડીયન જર્નલ ઓફ સોશ્યલ વર્ક કોણ પ્રકાશિત કરે છે ? - **તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સીસ**

292. આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? - **જિપ્સમ**

293. જિલ્લા કક્ષાની આપત્તી વ્યવસ્થાપન ઓથોરિટીનું નામ શું છે? - **ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)**

294. RTI એટલે શું ? - **Right to information**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

295. સૌથી વધુ ફિલ્મો ક્યા દેશમાં બને છે ? - **ભારત**

296. ગુજરાત રાજયનો સ્થાપના દિવસ ક્યો છે ? - **1લી મે**

297. આર.એસ.એસ.નું પૂરું નામ જણાવો. - **રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ**

298. દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતી 'સ્પેક્ટ્રોમીટર' કોલમના લેખક કોણ છે ? - **જય વસાવડા**

299. પીનકોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? - **રાજ્ય**

300. જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? - **રૂડયાર્ડ કિપ્લિંગ**

301. ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે ક્યો શબ્દ વપરાય ? - **લશ્કર**

302. 'અંગદનો પગ'ના લેખક કોણ છે ? - **હરેશ ધોળકિયા**

303. સાલારગંજ સંગ્રહાલય ક્યા આવેલું છે ? - **હૈદરાબાદમાં**

304. કઈ કંપની ONGCને હેલિકોપ્ટર સેવા આપે છે ? - **પવનહંસ**

305. 'રફાલ' શું છે ? - **યુદ્ધ વિમાન**

306. 'ફળો આવે છે, ત્યારે ડાળીઓ......' સુભાષિતના રચયિતા કોણ ? - **કુતુબ આઝાદ**

307. 'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ? - **અરબી**

308. સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ ક્યા ગીતકારને ગિનીઝ બુકમાં સ્થાન મળ્યું છે ? - **સમીર અંજાન**

309. યોગના કેટલા અંગો છે ? - **આઠ**

310. માન. પ્રધાનમંત્રીએ જનધન યોજનાનો પ્રારંભ ક્યાથી કરાવ્યો હતો ? - **દિલ્હી**

311. ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? - **સંસ્કૃત**

312. શારદાપીઠ નીચેનામાંથી ક્યા સ્થળે આવેલું છે ? - **દ્વારકા**

313. તેલંગાણા ભારતનું ક્યું રાજય બન્યું છે ? - **29મું**

314. 'તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા'- સૂત્ર કોણે આપ્યું હતું ? - **સુભાષચંદ્ર બોઝ**

315. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોના સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? - **શિવાજી મહારાજ**

316. ભારત એક ....દેશ છે. - **ધર્મ નિરપેક્ષ**

317. સાઠ વર્ષ પૂરા થયે ઊજવાતો ઉત્સવ ક્યા નામે ઓળખાય છે ? - **હીરક મહોત્સવ**

318. ગુજરાતમાં કન્યા કેળવણીના પ્રોત્સાહન માટે કઈ યોજના અમલમાં છે ? - **વિદ્યાલક્ષ્મી બોન્ડ**

319. શ્રી મોહનજી ભાવગત ક્યા સંઘના સરસંઘચાલક છે ? - **રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ**

320. ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? - **પ્રહર**

321. 2 જૂન, 2014ના રોજ તેલંગાણા રાજય ક્યા રાજયમાંથી જૂદુ થઈ નવું રાજય બન્યું ? - **આંધ્ર પ્રદેશ**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

322. 'લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ' પુસ્તકના લેખક કોણ હતા ? - **બી.કે.એસ.આયંગર**

323. સંપૂર્ણ શુદ્ધ સોનુ કેટલા કેરેટનું હોય છે ? - **24 કેરેટ**

324. ગુજરાત રાજયની વિધાનસભામાં કેટલી બેઠકો છે ? - **182**

325. ગુજરાતના પ્રાચીન નગર 'આનંદપુર'નું આધુનિક નામ શું છે ? - **વડનગર**

326. 'વરસાદ લાવવા માટે ગવાતો રાગ' - **મલ્હાર**

મહેસૂલી તલાટી - 2014

327. કઈ રોમન સંખ્યાનું મૂલ્ય 19 છે ? - **XIX**

TET- II - ભાષા - 2014

328. વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ આવકાર પામેલ દળદાર સંદર્ભગ્રંથ '2000 મિલેનિયમ ફ્લેશબેક'ના રચયિતા કોણ છે ? - **રજની વ્યાસ**

329. 6 થી 14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજીયાત શિક્ષણ પુરૂ પાડવા માટેનો ધારો એટલે ? - **RTE -2009**

330. વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય 'લાયબ્રેરી ઓફ કોંગ્રેસ'ક્યા આવેલું છે? - **અમેરિકા**

331. સંગીત પ્રિય પ્રાણી ક્યું છે ? - **ડુક્કર (પીગ)**

332. કાકપદનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ? - **લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા**

333. જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને ? - **પશ્ચિમ**

334. સ્વતંત્ર ભારતમાં પ્રસિદ્ધ થયેલ પ્રથમ પોસ્ટલ ટિકિટ ઉપર શું મુદ્રિત હતુ? - **જય હિન્દ**

TET- II - ભાષા - 2015

335. એક અબજમાં કેટલા મીંડા આવે ? - **નવ**
336. 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા ક્યા પંચે કહ્યું કે - શિક્ષણ એ ભીતરનો ખજાનો છે ? - **કોઠારી શિક્ષણ પંચ**
337. રાયપુર ક્યા રાજ્યનું પાટનગર છે ? - **છત્તીસગઢ**
338. ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે ? - **વિઠ્ઠલભાઈ પટેલ ભવન**
339. રાજ્ય અને તેના પાટનગર - **ત્રિપુરા - અગરતલ્લા, ઉત્તરાખંડ - દહેરાદૂન, સિક્કિમ - ગંગટોક**
340. 'સાઈલન્ટ વેલી' ક્યા રાજ્યમાં આવે છે ? - **કેરલ**
341. ભારતીય વાયુદળને સોંપવામાં આવેલ 'તેજસ' શું છે ? - **યુદ્ધ વિમાન**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

342. રણપ્રદેશમાં બીજના ચંદ્ર આકારના રેતીના ઢુવાને શું કહે છે ? - **બારખન**
343. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે ? - **વડોદરા**
344. નકશામાં લીલો રંગ કઈ વિગતો દર્શાવવા માટે વપરાય છે ? - **વનસ્પતિ**
345. ભારત સાર્વભૌમ રાજ્ય હોવાથી તેની નીતિઓનું ઘડતર નીચેનામાંથી કઈ રીતે થાય છે? - **ભારત પોતે જ પોતાની નીતિઓનુ ઘડતર કરે છે**
346. કેન્દ્ર સરકારે ગ્રાહકોની સુરક્ષાના કાયદાના અમલ માટે રચેલું કમિશન ક્યા નામે ઓળખાય છે ? - **રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ**

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર કલાર્ક - 2012

347. જોડકું ? - **ગીતા પ્રવચનો - વિનોબા ભાવે, ગીતાંજલિ - રવીન્દ્રનાથ ટાગોર, રામચરિતમાનસ - તુલસીદાસ**
348. સાઉદી અરેબિયા દેશની રાજધાની (પાટનગર) કઈ છે ? - **રિયાધ**
349. 'હિન્દી, હિન્દુ, હિન્દોસ્તાના'નો નારો કોણે આપ્યો હતો ? - **ભારતેંદુ હરીશચંદ્ર**
350. માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર **પ્રથમ ભારતીય કોણ હતા?** - **શેરપા તેનજિંગ**
351. ગાંધીજીની હત્યા દિલ્હીમાં ક્યાં સ્થળે થઈ હતી ? - **બિરલા ભવન**
352. ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ક્યા નામે ઓળખાય છે ? - **દુરાન્દ લાઈન**
353. સત્યના પ્રયોગો પુસ્તક ગાંધીજીએ ક્યાં લખ્યું હતું ? - **યરવડા**
354. ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે ક્યું વૃક્ષ સ્વીકારાયેલ છે ? - **વટવૃક્ષ**
355. 'રામનવમી' નીચેના પૈકી કઈ તિથિના રોજ ઉજવવામાં આવે છે? - **ચૈત્ર સુદ નોમ**
356. ભારતમાં સૌથી વધુ વરસાદ પડતો હોય તેવો વિસ્તાર નીચેના પૈકી ક્યા રાજ્યમાં આવેલ છે ? - **મેઘાલય**

જૂનિયર કલાર્ક પેપર - 1 - 2012

357. 2G સ્પેક્ટ્રમ ગોટાળામાં G એટલે શું ? - **જનરેશન (Generation)**

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

358. પ્રાણાયામમાં રેચકનો અર્થ એટલે... - **શ્વાસ છોડવો**
359. કોફેપોસાનો કાયદો ક્યાં પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? - **દાણચોરી**
360. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં ક્યાં સ્વરુપે રહેલું છે ? - **બોકસાઈટ**
361. રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના પૈકી કઈ વેબસાઈટ વધુ ઉપયોગી ગણાય ? - **OJAS**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

362. ગુજરાતના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં કઈ બાબત કેન્દ્ર સ્થાને હતી ? - **માહિતી અને પ્રત્યાયન તકનીકી**
363. ભારતની સહુથી લાંબી રેલવેમાર્ગ ધરાવતી ટ્રેઈન કે જે તારીખ 19-11-2011થી શરુ થઈ તે નીચેના પૈકી ક્યા બે શહેરનો જોડે છે? - **દિબ્રુગેઢ (આસામ)થી કન્યાકુમારી**
364. પુત્રી-પિતાની જોડીમાં સાચીછે? - **સીતા-જનક, પાંચાલી-દ્રુપદ, ઓખા-બાણાસૂર**
365. સને 2011માં વિશ્વનો 193મો દેશ બન્યો તેનું નામ - **દક્ષિણ સુદાન**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

366. ગુજરાતમાં પ્રચલિત જૂની મહેસુલી પદ્ધતિ મુજબ 1 (એક) વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ? - **2378 ચોરસ મીટર**
367. નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્ત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી છે ? - **મૂલાધાર-પૃથ્વી તત્ત્વ, મણિપુર-અગ્નિતત્ત્વ, અનાહત-જલ તત્ત્વ**
368. ક્યા પંખીનું અંગ્રેજી નામ 'હુપો' છે ? - **ઘંટીટાંકણો**
369. પીચ : : ક્રિકેટ : એરીના : :..............? - **જિમ્નાસ્ટિક**
370. નીચેની માહિતીને સમયાનુક્રમ મુજબ ગોઠવતાં સાચો ક્રમ ક્યો થશે ? - **વર્ષગાંઠ - રજત જયંતિ - સુવર્ણ જયંતિ - હીરક જયંતિ - શતાબ્દિ સમારોહ**
371. તેલંગણા દેશનું કેટલામું રાજ્ય બન્યું ? - **29**
372. તમાકુમાં ક્યું ઝેરી તત્ત્વ રહેલું છે ? - **નિકોટીન**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

373. ગુજરાત રાજ્યમાં ટેલીવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? - **સ્વાતંત્ર્ય દિવસ**
374. જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? - **પ્રો.વુડ્રો વિલ્સન**
375. રાજ્યમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના-જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? - **સંકલન**

376. ગિરની 'ચારણ કન્યા' જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું ? - **હીરબાઈ**

377. તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ નવો મંત્ર એફ.ડી.આઈ.નો અર્થ શું થાય છે ? - **ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા**

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

378. FIRનું પૂરું નામ શું છે ? - **First Information Report.**

379. રાષ્ટ્રીય મુદ્રા નીચે 'સત્યમેવ જયતે' કઈ લિપિમાં લખાય છે ? - **દેવનાગરી**

380. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? - **1907માં**

381. કોલસાથી થતું વિજળીનું ઉત્પાદન ક્યા નામે ઓળખાય છે ? - **થર્મલ ઈલેક્ટ્રિસિટી**

382. વાહનો માટે જરૂરી 'પીયુસી' સર્ટિફિકેટનું આખું નામ શું છે ? - **પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ**

383. પંજાબ ખાતે આવેલ શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા શહેરમાં સ્થિત છે ? - **અમૃતસર**

સબ ઓડિટર - 2015

384. ગુજરાત મુલ્કી સેવા નિયમો .... એ બહાર પાડ્યા છે. - **નાણાં વિભાગ**

385. બે વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ? - **સંતોષ યાદવ**

386. 'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી ક્યા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? - **મોબાઈલ ફોન** -

સબરજિસ્ટ્રાર - 2013

387. ગુજરાતમાં 'સ્ટેમ્પ અને નોંધણી'નો નીચેના કયા વિભાગમાં સમાવેશ થયેલ છે ? - **મહેસૂલ વિભાગ**

388. 1 હેક્ટર બરાબર કેટલા એકર ? - **અઢી**

389. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ? - **સંસ્કૃત**

390. ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ કેટલી ધારાસભ્યના બેઠકો મંજુર થયેલ છે ? - **182**

391. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે ? - **કલમ-58**

392. અભયારણ્ય અને તેના મુખ્ય પ્રાણીઓ - **કાઝીરંગા : ગેંડો, રતનમહાલ : રીંછ, રણથંભોર : વાઘ, વેળાવદર : કાળિયાર**

393. નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? - **એડમીરલ**

394. ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું ? - **હરીજન**

395. અમુલ ડેરીના સ્થાપક કોણ હતા ? - **ત્રિભુવનદાસ પટેલ**

396. એફિડેવીટમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરવો પડે ? - **20**

TAT - 2012

397. ધ લાસ્ટ જજમેન્ટના ચિત્રકાર....... છે ? - **માઈકલ એન્જેલો**

HTAT - 2012

398. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ 3, 5 અને 7માં માસ ક્યો છે? - **જેઠ, શ્રાવણ અને આસો**

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

399. હોળીનો તહેવાર કયા મહિનામાં આવે? - **ફાગણ**

400. ખ્રિસ્તી ધર્મનું પુજા સ્થાન કયું છે? - **ચર્ચ**

401. પીનકોડ કેટલા અક્ષરનો હોય છે? - **6**

402. અમુલ ડેરી ક્યાં આવેલી છે? - **આણંદ**

403. 'ડાલામથ્થો' એટલે શું? - **સિંહ**

404. તાજમહેલ કયા આવેલો છે? - **આગ્રા**

405. લક્ષ્મણની પત્નીનું નામ શું હતું? - **ઉર્મિલા**

406. 'ભાંગડા નૃત્ય કયા રાજય સાથે સંબંધિત છે? - **પંજાબ**

407. સંવત્સરી એ કયા ધર્મનું પાવન પર્વ છે? - **જૈનધર્મનું**

408. કબીરવડ ક્યાં આવેલો છે? - **શુકલતીર્થ**

409. સીતાનું બીજુ નામ શું છે? - **વૈદેહી**

410. મીઠું પકવવાની ક્યારીને શું કહે છે? - **અગર**

411. ગરબા કયા રાજયનું પ્રચલિત નૃત્ય છે? - **ગુજરાત**

412. દુધ શેમાં મપાય ? - **લિટર**

413. શીખોના ધાર્મિક સ્થાનને શું કહે છે? - **ગુરુદ્વારા**

414. શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે? - **કાચિંડો**

415 પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહે છે? - **ચણ**

416. અંધારીયાના છેલ્લા દિવસને શું કહે છે? - **અમાસ**

417. ખોરાક આપણા શરીરને શું આપે છે? - **શકિત**

418. આપણા દેશની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે? - **અમૂલ**

419. ATM નું પૂરું નામ શું છે? - **ઓટોમેટેડ ટેલર મશીન**

420. આંબાના ફુલને શું કહે છે? - **મહોર**

421. મીઠાઈ બનાવનારને શું કહેવાય ? - **કંદોઈ**

422. વડના ફળને શું કહેવાય? - **ટેટા**

PSI - 2012

423. રાષ્ટ્રીય કેલેન્ડર (શક સંવત) અંગ્રેજી વર્ષ મુજબ કયારે અપનાવવામાં આવ્યું? - **ઈ.સ. 1957**

424. વંદે માતરમ ગીત કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું ? - **આનંદમઠ**

425. ઓપ્ટિકલ ફાઈબર કેબલ શાના માટે વપરાય છે ? - **સંદેશ વ્યવહાર**

426. ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે ? - **તમિલનાડુ**

427. લોકસભાના સૌ પ્રથમ સ્પીકર નીચે જણાવેલ માંથી કોણ હતા? - **જી.વી.માવલંકર**

428. સાર્ક સંગઠનનું વડું મથક કયા આવેલું છે ? - **કાઠમંડુ**

429. **સાચુ જોડકુ ? - ગોવિંદ સાગર : સતલજ, વુલર : જેલમ, ઉકાઈ બંધ : તાપી**

430. ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે ? - **બાંગ્લાદેશ**

431. તીરુવનંતપુરમનું જુનુ નામ શું હતું ? - **ત્રિવેન્દ્રમ્**
432. દાદા સાહેબ ફાળકે એવોર્ડ ક્યા ક્ષેત્રમાં અપાય છે ? - **ફિલ્મ**
433. સશસ્ત્ર સીમા બલ ક્યા સરહદના રક્ષણ માટે છે ? - **ભારત-ભૂટાન અને ભારત-નેપાલ**
434. હિટલરની આત્મકથા મીનકેમ્ફ નો શાબ્દિક અર્થ શું છે ? - **મારો સંઘર્ષ**
435. સાચુ જોડકુ ? - **ગોમતી : લખનવ, સરયુ: અયોધ્યા, અલંકનંદા : બદ્રીનાથ**
436. ગુજરાત રાજયના સ્થાપના દિવસ કઈ તારીખે આવે છે ? - **1 મે**
437. વિધાન ? - **અર્ધકુંભ મેળો હરદ્વારમાં ભરાય છે, તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાય છે, પુષ્કરનો મેળો રાજસ્થાનમાં ભરાય છે.**
438. ત્રાસવાદી ઓસામા બિન લાદેનને જે ઓપરેશનમાં મારવામાં આવ્યો તેનું નામ શું હતું ? - **ઓપરેશન નેપ્ચ્યુન સ્પિયર**
439. 1 નોટીકલ માઈલ = ... km ? - **1.852**
440. ફેમા નો કાયદો ક્યા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? - **વિદેશી હુડીંયામણ**
441. કેનેસેટ ક્યાનું પાર્લામેન્ટ છે ? - **ઈઝરાયેલ**

PSI નશાબંધી - 2011

442. ભારતીય ચલણ માટે અપનાવેલ નવી નિશાની ? - **₹**
443. મહાત્મા મંદિર ક્યા આવેલું છે ? - **ગાંધીનગર**
444. પીનકોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? - **રાજ્ય**
445. 'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી ક્યા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? - **મોબાઈલ ફોન**
446. ગુજરાત સ્ટેટ પોર્ટલ ક્યું છે ? - **www.gujratindia.com**
447. વાયબ્રન્ટ ગુજરાત સમીટ ક્યારે યોજાય છે ? - **દર બે વર્ષે**
448. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી ? - **1949**
449. નૌકાદળનું તાલીમ કેન્દ્ર આઈએન.એસ વાલસુરા નીચેના પૈકી ક્યા સ્થળે છે ? - **જામનગર**
450. A.D.G.P.નું ફુલફોર્મ.... - **એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ**
451. ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી ? - **ઈ.સ.1861**
452. રેલવેના બ્રોડગેજ લાઈનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે ? - **1.676 મીટર**

એકાઉન્ટ ઓફિસર - 1999

453. 1 મીટર બરાબર મી.મી. થાય - **1000 મીમી**
454. ઓસ્ટ્રેલિયાનું પાટનગર ક્યું છે ? - **કેનબેરા**
455. સેતાનિક વર્સીસ નવલકથા કોણે લખી છે ? - **સલમાન રશ્દી**
456. ઝેંદ અવેસ્તા ક્યા ધર્મના ગ્રંથ છે ? - **પારસી**
457. ઈલિયડ અને ઓડિસી નામક મહાકાવ્યોની રચના કરી - **હોમર**
458. ક્રિસ્ટોફર કોલંબસે ક્યો ખંડ શોધ્યો ? - **અમેરિકા**
459. સ્ટીમર ડૂબી જવાની દુર્ઘટના પર કઈ ફિલ્મ બની ? - **ટાઈટેનિક**
460. એફિલ ટાવર ક્યા દેશમાં છે ? - **ફ્રાન્સ**
461. મહાત્મા ગાંધીનો જન્મ ક્યા થયો હતો ? - **પોરબંદર**
462. ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે ? - **મોર**
463. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને શું ખૂબ જ પ્રિય હતું ? - **ગુલાબ**

આંકડાકીય અધિકારી - 2000

464. વોર એન્ડ પીસ નવલકથાના લેખક કોણ છે ? - **લીયો ટોલ્સ્ટોય**
465. ઈસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી ધર્મના લોકોનું પવિત્ર શહેર ક્યું છે ? - **જેરુસલેમ**
466. સ્પેન દેશનું રાષ્ટ્રચિહ્ન ક્યું છે ? - **ગરૂડ**
467. ક્યા વડાપ્રધાને તેના શાસનકાળમાં RSS પર પ્રતિબંધ મૂક્યો હતો ? - **પી.વી.નરસિમ્હારાવ**
468. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યા વર્ષે થઈ ? - **1963**
469. ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્રેનનું નામ શું હતું ? - **સમજૌતા એક્સપ્રેસ**
470. 'ગોદાન' નામની પ્રસિદ્ધ કૃતિના સર્જક કોણ છે ? - **પ્રેમચંદજી**
471. SNDT મહિલા યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા ? - **મહર્ષિ ધોન્ડો કેશવ કર્વે**
472. ઈ.સ.1853માં સૌપ્રથમ રેલવે ક્યા શરૂ થઈ હતી ? - **મુંબઈ-થાણે**
473. MISAનું પૂરું નામ આપો. - **મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ**
474. મૃણાલિની સારાભાઈ, રુકમણીદેવી, હેમામાલિની ક્યા નૃત્ય સાથે સંલંગ્નિત છે ? - **ભરતનાટ્યમ**
475. પન્નાલાલ ઘોષ, હરિપ્રસાદ ચોરસિયા, રઘુનાથ શેઠ ક્યા સંગીત વાદ્ય સાથે જોડાયેલા છે ? - **બંસરી વાદક**
476. રીટા ફારિયા, ઐશ્વર્યા રાય, યુક્તા મુખી, ડાયના હેડને ક્યો ખિતાબ અંકે કરેલો છે ? - **મિસ વર્લ્ડ**

ચીફ ઓફિસર - 1999

477. ખલિલ જિબ્રાન કઈ ભાષાના સાહિત્યકાર છે ? - **અરબી**
478. વિટામીન 'સી' ક્યા ફળમાંથી વધુ પ્રાપ્ત થાય છે ? - **આમળાં**
479. વૈશ્વિક ધોરણે બાળકો માટે નવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરનાર મોન્ટેસરી ક્યા વિષયમાં પી.એચ.ડી. હતા ? - **દર્શનશાસ્ત્ર**
480. સુભાષ નેશનલ ઈન્સ્ટિટ્યૂટની કામગીરી જણાવો. - **રમતગમત**
481. આંબેડકર યુનિવર્સિટી કઈ રીતે શિક્ષણ આપે છે ? - **દુરવર્તી ઢબે**
482. ઈન્ટરપોલ શું છે ? - **વિશ્વના ગુના રોકતી સંસ્થા**

મેડિકલ ટ્યૂટર - 2000

483. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કોને કહેવાય ? - **શેખ મુજીબુર રહેમાન**
484. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? - **શ્રીમદ્ રાજચંદ્ર**

485. ભીષણ દુષ્કાળને નિરૂપતી ફિલ્મમાં રૂપાંતરિત ગુજરાતી નવલકથા કઈ છે ? - **માનવીની ભવાઈ**

486. મ્યાનમાર ક્યા દેશનું નવું નામ છે ? - **બર્મા (બ્રહ્મદેશ)**

487. યોગક્ષેમં વહામ્યહમ કોનું મુદ્રા વિધાન છે ? - **LIC**

488. જેરુસલેમ ક્યા ધર્મનું પવિત્ર શ્રદ્ધા કેન્દ્ર છે ? - **યહૂદી, ખ્રિસ્ત, મુસ્લિમ**

489. લાવણી ક્યા પ્રદેશની પરંપરાગત લોકકલા છે ? - **મહારાષ્ટ્ર**

490. વિજયઘાટ કોનું સમાધિ સ્થળ છે ? - **લાલ બહાદુર શાસ્ત્રી**

491. આર્યભટ્ટ ક્યા વિજ્ઞાન સાથે સંકળાયેલા હતા ? - **ખગોળ વિજ્ઞાન**

492. ગોમતેશ્વર બાહુબલીની ઊંચી પ્રતિમાં ક્યા આવેલી છે ? - **શ્રવણ બેલગોડા**

493. રોમન લિપિમાં 14 કઈ રીતે લખાય ? - **XIV**

494. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? - **નાઈલ**

495. ભારતનું રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન ક્યા સંગ્રહાલયમાં સુરક્ષિત છે ? - **સારનાથ**

496. જગપ્રસિદ્ધ કોણાર્કનું સૂર્યમંદિર ક્યા આવેલું છે ? - **ઓડિશા**

497. બૃહદ મુંબઈમાંથી સ્વતંત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર ક્યારે બન્યા? - **1960**

498. જાપાનનું ચલણી નાણું ક્યું છે ? - **યેન**

499. વૈશ્વિક ધોરણે ક્યા લોકો સર્વાધિક ધર્મ પાળે છે ? - **ખ્રિસ્તી**

500. બ્રોડગેજ રેલવેના બે પાટા વચ્ચેનું અંતર - 1.68 મી.

501. જગજીતસિંહ કઈ બાબત માટે જાણીતા હતા ? - ગઝલ ગાયકી

502. બાંગ્લાદેશ ક્યારે પાકિસ્તાનથી સ્વતંત્ર થયુ ? - **26 માર્ચ, 1971**

503. મુંબઈનું દલાલ સ્ટ્રીટ કઈ બાબત સાથે સંલંઘિત છે ? - **શેર બજાર**

504. પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથના રચયિતા કોણ છે ? - **હેમચંદ્રાચાર્ય**

505. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ? - **હોકી**

506. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યું છે ? - **માઉન્ટ એવરેસ્ટ**

507. 'કલમ આજ ઉનકી જય બોલ' ઉદ્‌ગાર ક્યા કવિની કવિતાના છે ? - **કવિ પ્રદિપજી**

આયુર્વેદિક ડોક્ટર - 2000

508. ભારતીય આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનું નામ આપો. - **એર ઈન્ડિયા**

509. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? - **ડૉ.રાજેન્દ્ર પ્રસાદ**

510. વિશ્વમાં સૌથી વધુ ચાંદીનું ઉત્પાદન કરતો દેશ ક્યો છે ? - **મેક્સિકો**

511. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા પ્રથમ વખત કોણે કહ્યું ? - **સુભાષચંદ્ર બોઝ**

512. બેન્કોની બેન્ક એટલે ? - **ભારતીય રિઝર્વ બેંક**

513. લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન ક્યા રંગનું દેખાય ? - **કાળુ**

514. કમ્પ્યૂટર વિજ્ઞાનના પિતા કોણ છે ? - **ચાર્લ્સ બેબેજ**

515. મધ્ય પ્રદેશમાંથી ભાગ પાડી બનાવેલું રાજ્ય ક્યું છે ? - **છત્તીસગઢ**

516. ક્યા દેશને સુગર બાઉલ કહેવાય છે ? - **ક્યુબા**

517. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી ? - **સ્વામી વિવેકાનંદ**

518. અજંતા-ઈલોરાની ગુફા ક્યા રાજ્યમાં આવેલી છે ? - **મહારાષ્ટ્ર**

519. મુંબઈના સહારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ શું છે ? - **છત્રપતિ શિવાજી**

520. દેવદાસ કૃતિના સર્જક કોણ છે ? - **શરદચંદ્ર ચેટરજી**

521. કાલિદાસને કઈ ભાષા માટે મહાકવિનું બિરુદ મળેલું ? - **સંસ્કૃત**

522. માનસિક દર્દી માટે મનોવિશ્લેષણની ઉપચાર પદ્ધતિના શોધક કોણ છે ? - **સિગ્મંડ ફ્રોઈડ**

523. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ? - **1967 (જામનગર)**

524. તાજમહેલ કઈ નદીના કિનારે છે ? - **યમુના**

525. રેડક્રોસ સંસ્થાના સ્થાપક કોણ છે ? - **હેનરી ડ્યુનેન્ટ**

વૈદકિય સેવા - 2000

526. યુરોપના દેશોએ સર્વસ્વીકૃત કરેલું ચલણ એટલે ? - **યુરો**

527. ઈદે મિલાદ ઉજવાય - **પયગમ્બર સાહેબના જન્મદિન પ્રસંગે**

528. રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા હોય છે ? - **24**

529. વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કોણે અમલમાં મૂક્યું ? - **અમેરિકા**

530. ચંદીગઢ શહેરના સ્થપતિ કોણ હતા ? - **લા કાર્બુઝિયર**

531. લંડનમાં આવેલી ભારતની હાઈકમિશનરની ઓફિસ ક્યા નામથી ઓળખાય છે ? - **ઈન્ડિયા હાઉસ**

532. પર્શિયા ક્યા દેશનું પ્રાચીન નામ છે ? - **ઈરાન**

533. ઓનમ ક્યા રાજ્યનો તહેવાર છે ? - **કેરળ**

534. ઈરાનની લોકસભાને શું કહેવાય છે ? - **મજલીસ**

535. તાસ ક્યા દેશની ન્યૂઝ એજન્સી છે ? - **રશિયા**

536. ભારતનો સૌથી મોટો પુરસ્કાર ક્યો છે ? - **ભારતરત્ન**

537. પાયથાગોરસનો સિદ્ધાંત કઈ બાબતને અનુલક્ષીને છે ? - **કાટકોણ ત્રિકોણ**

538. ચાર્લી ચેપલીન ક્યા દેશનો વતની હતો ? - **ઈંગ્લેન્ડ**

539. રામાયણમાં દશાનન કોને કહે છે ? - **રાવણ**

540. કમ્પ્યૂટર કઈ ભાષા સમજે ? - **બાયનરી લેંગ્વેજ**

541. માઈક્રોસોફ્ટના પિતા કોણ છે ? - **બિલ ગેટ્સ**

આંકડાકીય અધિકારી - 2000

542. નેપિયન સી રોડ ક્યા શહેરમાં આવેલો છે ? - **મુંબઈ**

543. માઈકલ એન્જેલોનું નામ ક્યા દેશ સાથે જોડાયેલું છે ? - **ઈટાલી**

544. શાંતિદૂતનું ઉપનામ મેળવનાર વ્યક્તિનું સમાધિ સ્થળ ક્યું છે ? - **શાંતિવન**

545. એક ટ્રિલિયન એટલે એકડા પર કેટલા મીંડા આવે ? - **12**

546. કવિ કલાપીની જન્મભૂમિ કઈ હતી ? - **લાઠી**

547. લવબગ એટલે શું ? - **કમ્પ્યૂટર વાઈરસ**

કોમર્શિયલ ટેક્સ ઇન્સપેક્ટર - પેપર-2 - 2017

548. ડીડી ન્યૂઝ ચેનલ હાલ કેટલી ભાષામાં સમાચાર પ્રસારિત કરે છે? - **ચાર**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

549. અનિશ્ચિત મુદ્દત સુધી સભાગૃહને મુલતવી રાખવાને શું કહેવાય ? : **સાઈન ડાઈ (Sine Die)**
550. પુત્રએ પ્રત્યેક અવસ્થામાં માતા-પિતાનું ભરણપોષણ કરવું કોણે કહ્યું છે ? : **ચાણક્ય**
551. બનાવટી આસું કોના કહેવાય ? : **મગર**
552. હિન્દુ માન્યતા મુજબ ભગવાનના વૈદ્ય કોણ છે? : **ધન્વંતરી**
553. માણસનો પહેલો ગુરુ કોણ ગણાય ? : **માતા**
554. એમના પૂછો કે દેશ તમારા માટે શું કરશે, પૂછો તમે દેશ માટે શું કરશો - કોણ કહ્યું છે? : **અબ્રાહિમ લિંકન**
555. હનુમાનજીના પિતા કોણ હતા ? : **વાયુદેવ**
556. રામકૃષ્ણ પરમહંસે ક્યા ધર્મની સાધના કરી હતી ? : **દરેક ધર્મોની**
557. શાંતિવન કોનું સમાધિ સ્થળ છે ? : **પંડિત જવાહરલાલ નહેરુ**
558. તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે ? : **યમુના**
559. મધર ટેરેસા ક્યા દેશના વતની હતા ? : **યુગોસ્લાવિયા**
560. ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ પુસ્તકના લેખક કોણ છે ? : **એસ. રાધાકૃષ્ણન**
561. ટુ બી ઓર નોટ ટુ બી પુસ્તક કોના જીવન ઉપર આધારિત છે? : **અમિતાભ બચ્ચન**
562. કીર્તિસ્તંભ ક્યા આવેલો છે? : **ચિત્તોડગઢ**
563. IAS અધિકારીઓને ક્યા તાલીમ અપાય છે? : **મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડમીમાં**
564. મિથિલા નગરીની રાજકુમારી કોણ હતા ? : **સીતા**
565. લોકાયત દર્શન આપનાર ઋષિ કોણ હતા ? : **ચર્વાક**
566. શેરબજારમાં તેજી દર્શાવતું પ્રતિક ક્યું છે? : **આખલો**
567. દેવોના કોષાધ્યક્ષ કોણ હતું ? : **કુબેર**
568. ભારતીય સૈન્યનો પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ છે ? : **જનરલ માણેકશા**
569. અટલ બિહારી વાજપેયીના કાવ્યોને કોણે કંઠ આપ્યો ? : **જગજિતસિંહ**
570. અમેરિકાના પ્રમુખની અવધિ કેટલા વર્ષની હોય છે? : **4 વર્ષ**
571. ઉલ્ફા ઉગ્રવાદીઓ ક્યા રાજ્યમાં સક્રિય છે ? : **આસામ**
572. એફિલ ટાવર ક્યા દેશમાં આવેલો છે? : **ફ્રાન્સ**
573. ભારતનું ક્યું શહેર ગુલાબી શહેર તરીકે ઓળખાય છે? : **જયપુર**
574. હિબ્રુ ક્યા દેશમાં વધુ બોલાય છે? : **ઈઝરાયેલ**
575. બાર્ટર પદ્ધતિ શું છે? : **ચીજવસ્તુઓની અદલાબદલી**
576. શ્રીનિવાસ રામાનુજન ક્યા ક્ષેત્રે જાણીતા હતા ? : **ગણિત**
577. એમ.વિશ્વેસરૈયા કોણ હતા ? : **ભારતીય ઈજનેર**
578. NCERTનું પૂરું નામ આપો. : **નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ**
579. પારસીનું નવું વર્ષ ક્યા નામે ઓળખાય ? : **પતેતી**
580. ગુજરાતમાં પ્રથમ કોલેજ કઈ હતી ? : **ગુજરાત કોલેજ**
581. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ક્યા આવેલી છે? : **પુના**
582. ભારતના ક્યા રાજ્યની પ્રાંતિય ભાષા બાંગ્લાદેશની રાષ્ટ્રભાષા છે ? : **પશ્ચિમ બંગાળ**
583. મોર્ડન આર્ટના પ્રણેતા કોણ છે? : **પાબ્લો પિકાસો**
584. અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની, આંચલ મેં હૈ દૂધ ઔર આંખો મેં પાની ક્યા કવિની રચનામાંથી લેવાયેલું છે ? : **મૈથીલીશરણ ગુપ્ત**
585. ભારતીય રેલમાં RAC એટલે શું થાય ? : **રિઝર્વેશન અગેઈન્સ્ટ કેન્સલેશન**
586. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ છે? : **વિદ્યાગૌરી નીલકંઠ**
587. સરદાર ફિલ્મમાં સરદારની ભૂમિકા કોણે ભજવી હતી ? : **પરેશ રાવલ**
588. સ્વામી વિવેકાનંદે ક્યા શહેરમાં હિન્દુ ધર્મનો જયકાર કરાવ્યો ? : **શિકાગો**
589. પંદર દિવસમાં એકવાર પ્રકાશિત થાય તે ? : **પાક્ષિક**
590. સૌપ્રથમ ડીઝનીલેન્ડ ક્યા બનાવાયું હતું ? : **અમેરિકા**
591. કિસાનઘાટ કોનું સમાધિસ્થળ છે ? : **ચૌધરી ચરણસિંહ**
592. મોટરના શહેર તરીકે જાણીતું ક્યું છે? : **ડેટ્રોઈટ**
593. ભારતીવ કુસ્તીબાજોના આરાધ્યક દેવ કોણ છે? : **બજરંગબલી**
594. પંચાયતી રાજ કેટલા સ્તરોનું બનેલું છે? : **3**
595. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)નું વડુંમથક ક્યાં આવેલ છે ? : **નવી દિલ્હી**
596. મહાકવિ દાન્તે ક્યા દેશમાં થઈ ગયા ? : **ઈટાલી**
597. નેશનલ જિઓફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે? : **હૈદરાબાદ**
598. મંડલ પંચનો અહેવાલ કઈ બાબતને લગતો હતો ? : **પછાત વર્ગ**
599. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે? : **કલેક્ટર**
600. રીચર સ્કેલ કઈ બાબતનું સાધન છે? : **ધરતીકંપ**

601. સિક્કિમની રાજધાની કઈ છે ? : **ગંગટોક**

602. લગ્નના નિયમો-બંધનો ક્યા ગ્રંથમાં લખાયેલા છે? : **મનુસ્મૃતિ**

603. 1 કિલોમીટરના કેટલા માઈલ થાય ? : **0.621 માઈલ** (**1 માઈલ = 1.609 કિ.મી. થાય.**)

604. મુંબઈ ખાતે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ની સ્થાપના ક્યારે થઈ ? : **1975**

605. UNCLOS કઈ બાબત સાથે સંકળાયેલ છે ? - **સમુદ્રને લગતા કાયદાઓ અંગે એકસૂત્રતા જાળવવા**

606. પીગ્મી આદિજાતી જોવા મળે ? - **કોંગો**

607. NCERTનું વડુંમથક ક્યાં આવેલું છે ? : **નવી દિલ્હી**

608. આસવાન બંધ કઈ નદી પર સ્થિત છે? - **નાઈલ**

609. જોર્ડનની કરન્સી કઈ છે ? - **દીનાર**

610. તેજસ ટ્રેનને ક્યા સ્થળ ખાતેની રેલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવેલી છે ? - **કપુરથલા**

611. સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણી કોણ કરે છે ? - **વ્યવસ્થાપક સમિતિના સભ્યો**

612. કલહારીના રણમાં કઈ આદિજાતિ જોવા મળે છે ? - **બુશમેન**

613. તાજેતરમાં ચર્ચામાં આવેલ 'બિટકોઈન' એ શું છે? : **ક્રિપ્ટો અથવા વર્ચ્યુઅલ કરન્સી છે**

614. મુદલિયાર શિક્ષણ પંચની રચના થઈ હતી ? - **માધ્યમિક શિક્ષણ પંચ**

615. સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ નિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂક થાય ? - **વહીવટદાર**

616. તાજેતરમાં આવેલ 'ઓખી'નામના વાવાઝોડાએ અનેક સ્થળોને નુકસાન પહોંચાડ્યું. આ વાવાઝોડાનું નામ 'ઓખી' ક્યા દેશે આપેલ છે ? : **બાંગ્લાદેશ**

617. રશિયા સાથે કઈ કરન્સી સંબંધિત છે ? - **રશિયન રૂબલ**

618. તેજસ ટ્રેન કેટલા કિમી/ કલાક અને તેથી વધારે ઝડપે ચાલશે ? - **130**

619. મિસ દારૂવાલા ક્યા પોપ્યુલર મેગેઝિનમાં પત્રકારની સેવા આપે છે ? - **વર્લ્ડ મેગેઝિન**

620. 'ગોરખાલેન્ડ' એ ક્યા રાજ્ય સંબંધી આંદોલન છે ? : **પશ્ચિમ બંગાળ**

621. સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે ભારત સરકારનું ક્યું નિગમ કામ કરે છે ? - **નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન**

622. હૈસા (Housa) આદિજાતિની વસતી છે - **નાઈજિરીયા**

623. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીસર્ચ એજ્યુકેશન (IITE)......... કક્ષાની સંસ્થા છે. - **રાજ્ય**

624. કેટલાન વાસીઓ દ્વારા 'કેટલાન' વિસ્તારને મુક્ત કરવા ક્યા દેશમાં લડત ચલાવાઈ હતી ? : **સ્પેન**

625. સીમાંગ આદિજાતિનો પ્રદેશ ક્યો છે ? - **મલેશિયા**

626. ગુજરાતમાં માધ્યમિક કક્ષાએ હાલ કઈ શિક્ષણ પદ્ધતિ અમલમાં છે ? - **શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન**

627. વિસ્તરણ કાર્યક્રમોમાં સામાન્ય રીતે ક્યું પ્રોજેક્ટર વપરાય છે ? - **16મીમી**

628. ઈરાકનું ચલણી નાણું જણાવો. - **દીનાર**

629. વિશ્વમાં બીન્દાબાઉ આદિજાતિનું પ્રમાણ જણાવો. - **વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા**

630. જમીનની ઉષ્માવાહકતા ઉપર ખેડકાર્યોની અસર કેવી થાય છે ? - **ઘટે છે**

631. ગોવાની રાજધાની જણાવો. - **પણજી**

632. ન્યૂઝિલેન્ડમાં કઈ આદિજાતિ જોવા મળે છે ? - **માઓરી**

633. સહકારી મંડળીના કામકાજના સંચાલનનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે ? - **વ્યવસ્થાપક સમિતિ**

634. તારર આદિજાતિનો વિશ્વમાં વિસ્તાર જણાવો. - **સાઈબેરિયા**

635. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ ક્યા વર્ષમાં ઘડવામાં આવ્યો છે ? - **1961**

636. એનાઉ આદિ જાતિ દુનિયામાં ક્યા જોવા મળે છે ? - **જાપાન**

637. સહકારી ક્ષેત્રમાં સભાસદોનો લોકશાહી અંકુશ કઈ બાબતને સ્પર્શે છે ? - **સહકારનો સિદ્ધાંત**

638. ઓડિશાની રાજધાની કઈ છે ? - **ભુવનેશ્વર**

639. વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? : **માનવ અધિકાર દિવસ**

640. સહકારી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના મતદારો કોણ હોય છે ? - **સભાસદો**

641. કાળા બજાર નિવારણ અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની જાણકારી અધિનિયમ ક્યા વર્ષથી અમલમાં મૂકેલ છે ? - **1980**

642. સામુદ્રીક હલનચલન પ્રવાહ માટે ક્યું બળ જવાબદાર છે ? - **તાપમાન**

643. સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદ્દત પૂર્ણ થવા છતાં નવીન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ? - **કસ્ટોડિયન**

644. ઝારખંડની રાજધાની કઈ છે ? - **રાંચી**

645. ભરતી-ઓટ માટે ક્યું બળ જવાબદાર છે ? - **ગુરુત્વાકર્ષણ**

646. NCUIનું પૂરું નામ આપો. - **નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા**

647. 1 **nanometre** = ... **cm** : 10^{-7}

648. સામુદ્રીક હલનચલન જળજથ્થા માટે બળ/કારણ જવાબદાર છે - **ઘનતા**

649. સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પ્રત્યેક સભાસદને કેટલા મત મળે છે? - **એક**

650. સહકારના સિદ્ધાંતો કેટલા છે ? - **સાત**

651. સામુદ્રીક હલનચલન મોજા માટે ક્યું બળ જવાબદાર છે ? - **પવન**

652. સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા કોણ છે ? - **જિલ્લા રજિસ્ટ્રાર**

653. આગાખાન કપ કઈ રમત સાથે યોગ્ય બેસે છે ? - **હોકી**

654. 'ભારતમાં બાળલગ્નો વિવાહ' તથા 'બળજબરીથી વિધવાપણુ' પર બે નોંધ કોના દ્વારા લખાઈ છે ? - **બહેરામજી મલબારી**

655. ભારતમાં માણસોના જીવન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સ્વૈચ્છિક માનવતાવાદી અભિગમ ધરાવતી સંસ્થા કઈ છે ? : **ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી**

656. દક્ષિણ કોરિયાનું ચલણી નાણું જણાવો. - **વોન**

657. ફેયડો (Phaedo) ઓન ધ સોલ (On the Sou) તરીકે પણ જાણીતા સંવાદો કોના છે ? - **પ્લેટો**

658. મધ્યમમાર્ગ અનુસરવા/અપનાવવા માટેના સિદ્ધાંતનો કોણે પ્રસાર/ફેલાવો કર્યો ? - **ભગવાન બુદ્ધ**

659. સુ-શાસન લાવવા માટે નીતિ તથા નૈતિક મૂલ્યોની ભૂમિકા નોંધપાત્ર છે. નીચેનામાંથી ક્યા ઘટકો શાસનના નૈતિક મુલ્યોને દઢ કરશે ? - **નિઃસ્વાર્થપણુ**

660. ઈજિપ્તનું ચલણ ક્યું છે ? - **પાઉન્ડ**

661. 'હું નથી હિંદુ કે નથી મુસ્લિમ. હું ઈશ્વરનો અનુયાયી છું' આવુ કોણે કહ્યું હતું ? - **ગુરૂ નાનક** -

662. કબીરે ભારપૂર્વક જણાવ્યું કે ઈશ્વરને પામવા માટેનો એકમાત્ર રસ્તો .... છે. - **ભક્તિ**

663. આધુનિક નીતિશાસ્ત્રમાં 'પ્રાયશ્ચિત' એટલે - **ખરાબ કર્મોનો પસ્તાવો કરવો**

664. ....ભાષામાં એથિક્સ (Ethics)ને એથિકોસ (Ethikos) તરીકે ઓળખવામાં આવે છે ? - **ગ્રીક**

665. 'સૌથી વધારે લોકો માટે સૌથી વધારે શું સારૂ છે' તે આધાર પર લેવાતી નિર્ણય એટલે...... - **ઉપયોગિતાવાદ અભિગમ**

666. અગરતલા ક્યા રાજ્યની રાજધાની છે ? - **ત્રિપુરા**

667. નૈતિક સંબંધવાદ એક એવો સિદ્ધાંત છે કે - **જુદા જુદા સમાજો જુદી જુદી નૈતિક માન્યતાઓ ધરાવે છે અને આપણે તે અંગે મત બાંધી શકીએ નહી**

668. હુખ્તા 'સારા શબ્દો' એ નીચે દર્શાવેલ ધર્મોમાનો કોઈ એકનો મૂળભૂત સિદ્ધાંત છે ? - **જરથોસ્ત્રવાદ**

669. વેપાર અંગે ગાંધીજીના દાર્શનિક આધાર નીચેનામાંથી કોઈ એક ખ્યાલ ધરાવે છે. - **ન્યાસધારિતા**

670. 'સમાન લોકો સાથે સમાન રીતે અને અસમાન લોકો સાથે અસમ રીતે વ્યવહાર કરવો જોઈએ' આ વિધાન કોના દ્વારા કહેવાયું છે ? - **એરિસ્ટોટલ**

671. ઈટાલીનું ચલણી નાણું જણાવો. - **યુરો**

672. ....સૂચવે છે કે નૈતિક વ્યવહાર એક એવો મધ્યમ માર્ગ (વચલો માર્ગ) છે કે જે બે અંતિમો વચ્ચેનું બિંદુ છે. - **એરિસ્ટોટલ**

673. 100 સેમી = કેટલા મીટર? : **1 મીટર**

674. આ કોણે કહેલું 'હા, હુ ભગવાન જોઈ શકું છું, જેમ હું તમને અહીયા જોવ છું, પરંતુ તે ઘણા ગહન અર્થમાં ભગવાન મળી શકે છે' - **રામકૃષ્ણ પરમહંસ**

675. નાગાલેન્ડની રાજધાની કઈ છે ? - **કોહિમા**

676. ઉદ્દેશવાદનો સિદ્ધાંત નૈતિક ભલમનસાઈનું કેન્દ્ર નીચેનામાંથી કોઈ એકમાં ઈંગીત કરે છે. - **પરિણામ**

677. 'આધ્યાત્મિક માનવતાવાદ'નું પ્રતિષ્ઠાન કોના દ્વારા કરવામાં આવ્યું ? - **સ્વામી વિવેકાનંદ**

678. ન્યાયની વ્યાખ્યા, આદર્શ શહેર રાજ્યની વ્યવસ્થા અને ચારિત્ર્ય અને આદર્શ વ્યક્તિ લગતા પ્લેટો દ્વારા લખાયેલ સોક્રેટીસના સંવાદ ક્યા છે ? - **ધ રીપબ્લિક**

679. ખાદી એ ક્યા પ્રકારનું કાપડ છે ? : સેલ્યુલોઝીક

680. મલેશિયાનું ચલણી નાણું ક્યું છે ? - **રિંગીટ**

681. બ્રહ્માંડીય દઢતા (Cosmic Determinism) અને માનવ સ્વતંત્રતા વચ્ચેના સક્રિય સંબંધના ચુકાદાની ત્રુટિઓમાંથી વિનાશક સંવેદનાઓ પરિણમે છે આવી શિખ કોણે આપી ? - **સ્ટોઈક્સ**

682. 'મનુષ્યનો ધર્મ કોઈપણ હોય એ તો જ પર્યાપ્ત હોય જો તે બહેતર મનુષ્ય બનાવે' - **શ્રી નારાયણ ગુરુ**

683. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલ એરપોર્ટનું નામ જણાવો.- **રાજા ભોજ એરપોર્ટ**

684. મેડીકલ વેસ્ટનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે ? - **7**

685. ઈમ્ફાલ ક્યા રાજ્યની રાજધાની છે ? - **મણિપુર**

686. કામદાર વીમા ધારાને ઈ.સ.........થી કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું. - **1948**

687. 100 હેક્ટર બરાબર કેટલા ચો.કિ.મી. થાય ? - **1**

688. ક્યું દ્રવ્ય પ્રાણિજ છે અને વસ્ત્રો બનાવવા ઉપયોગી છે ? - **સિલ્ક**

689. સ્ટેટ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રૂપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? - **મુખ્ય સચિવ**

690. 100 હેક્ટર બરાબર કેટલા ચો.કિ.મી. થાય ? : **1**

691. સ્પેઈનની કરન્સી કઈ છે ? - **યુરો**

692. IASBનું પૂરું નામ શું છે ? - **International Accounting Standard Board**

693. દર વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે આવે છે ? - **ભાદરવા સુદ ચોથ**

694. મલેશિયાનું ચલણી નાણું જણાવો. - **રિંગીટ**

695. CBSE બોર્ડનું પૂરું નામ જણાવો. - **Central Board of Secondary Education**

696. કોફેપોસા (COFEPOSA) એક્ટનું પૂરું નામ જણાવો. - **Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities Act.**

697. મેડિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જરૂરી NEET પરીક્ષાનું પૂરું નામ જણાવો. - **National Eligibility cum Entrance Test**

698. ....એ પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો છે. - **મેસ્લો**

699. વયોવૃદ્ધને લગતો સિદ્ધાંત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો ? - **1991**

700. આંધ્રપ્રદેશની રાજધાની જણાવો. - **અમરાવતી**

701. ડુક્કરના માંસને શું કહેવામાં આવે છે ? - **પોર્ક**

702. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટીસ એ.કે. સિકી, જસ્ટીસ એ.એમ.ખાનવીલકર ઉપરાંત ક્યા બે જજીસે મળી તાજેતરમાં ઈચ્છા મૃત્યુ અંગેનો ચુકાદો આપ્યો ? - **જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટીસ અશોક ભૂષણ**

703. ગરુડ (Eagle) ક્યા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે ? - **કેનેડા**

704. ક્યો શબ્દ 'ઓકસફર્ડ ડિક્શનેરીનો હિંદી શબ્દ-2017' તરીકે જાહેર કરવામાં આવ્યો ? - **આધાર**

704. ચશ્મા આ ચિહ્ન ભારતના ક્યા રાજકીય પક્ષનું છે ? - **ભારતીય રાષ્ટ્રીય લોકદળ**

705. એસ.ટી. નિગમ કઈ પરમીટ હેઠળ બસોનું સંચાલન કરે છે ? - **સ્ટેજ કેરેજ**

706. રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો. : **ધ એરી ઓરયાર્ડ**

707. લર્નિંગ લાઈસન્સ કેટલા સમય સુધી અમલમાં રહે છે ? - **છ મહિના**

708. પ્રાથમિક ચિકિત્સાના નિયમો 'ABC' પૈકી Bનો અર્થ - **બ્રીથિંગ**

709. ગુજરાત નિગમ દ્વારા મહિલા કન્ડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી ? - **વર્ષ 2012**

710. કઈ કંપનીને ભારત સરકાર તરફથી 10,000 ઈલેક્ટ્રિકલ વાહનોનો ઓર્ડર મળ્યો છે ? - **ટાટા મોટર્સ**

711. સિક્કિમનું પાટનગર ક્યું છે ? - **ગંગટોક**

712. વસતીની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે ? - **ઉત્તર પ્રદેશ**

713. ચિલકા સરોવર ક્યા રાજયમાં આવેલ છે ? - **ઓરિસ્સા**

714. રબરનું ઉત્પાદન ભારતનું ક્યું રાજ્ય સૌથી વધુ કરે છે ? - **કેરાલા**

715. દીવ કઈ હકુમત નીચે હતું ? - **પોર્ટુગીઝ**

716. મિઝોરમની રાજધાની કઈ છે ? - **ઐઝવાલ**

717. પારસીઓ ભારતમાં પહેલા ક્યા સ્થળે આવ્યા હતા ? - **સંજાણ**

718. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યા વર્ષમાં થઈ ? - **1853**

719. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું ? - **1923**

720. ઈ.સ.1962માં જ્ઞાનસત્ર ક્યા યોજાયું હતું ? - **દાહોદ**

721. ભારતમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્નમેન્ટની સ્થાપના ક્યારે થઈ ? - **1956**

722. સંયુક્ત આરબ અમીરાત ....નું સંઘ છે. - **7 અમીરાત**

723. ઉત્તરાખંડની રાજધાની જણાવો. - **દહેરાદૂન**

724. નરરાજાના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં કોણ સફળ થાય છે ? - **કળિ**

725. આજકાલ વીજળીના બલ્બમાં ઉપયોગમાં આવતા એલ.ઈ.ડી.નો શું અર્થ થાય છે ? - **લાઈટ ઈમીટિંગ ડાયોડ (Light Emitting Diode)**

726. ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક તરીકે ઓળખાતા નેતાનું નામ શું છે ? - **કિમ જોંગ**

727. પેટ્રોલનું બીજું નામ શું છે ? - **ગેસોલિન**

728. કઈ ઈમારત ટ્રેડમાર્ક ધરાવે છે ? - **એફેલ ટાવર, ઓપેરા હાઉસ, તાજમહાલ પેલેસ હોટલ**

729. શેક્સપિયરની પ્રખ્યાત રચનાઓ ઉપર ફિલ્મો બનાવવામાં આવે છે. કઈ ફિલ્મો શેક્સપિયરની રચના આધારિત છે ? - **ઓમકારા, હૈદર, મકબુલ**

730. કેરળની રાજધાની કઈ છે ? - **તીરુવનંતપુરમ**

731. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? - **182**

732. 1 સેકન્ડ = મિલિ સેકન્ડ. - **1000**

733. 1 હેક્ટર = ... એકર. - **2.47**

734. ભારતમાં 'સિવિલ એક્ટ' શબ્દ સૌપ્રથમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો ? - **1765**

735. જમીન મહેસૂલ અંગે એંડરસનના બનાવેલા નિયમો બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ-1921ની સામે નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવ્યા છે ? - **1972**

રમત-ગમત

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. આવનારા વર્ષ 2018માં એશિયન ગેઈમ્સ કયા દેશમાં રમાશે?
   A) મ્યાનમાર (બર્મા)　B) ઈન્ડોનેશિયા
   C) નોર્થ કોરિયા　D) મલેશિયા

રેવન્યૂ તલાટી - 28/02/2016

2. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
   a) કે.ડી. જાધવ　1) વેઈટ લિફ્ટિંગ
   b) અભિનવ બિન્દ્રા　2) કુસ્તી
   c) કર્ણમ મલ્લેશ્વરી　3) ટેનિસ
   d) લિએન્ડર પેસ　4) એર રાયફલ શુટિંગ
   A) a-1, b-4, d-3, c-2　B) c-1, d-4, a-3, b-2
   C) d-2, a-4, b-3, c-1　D) b-4, c-1, d-3, a-2

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

3. કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે'લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ' અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?
   A) વિજયસિંહ　B) વિજેન્દ્રસિંહ
   C) સંગ્રામસિંહ　D) યોગેશ્વરસિંહ
4. કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્ટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મીનીટમાં તરીને પૂરું કર્યું?
   A) ભારતી વર્મા　B) ભાનુ શર્મા
   C) ભાવના વર્મા　D) ભક્તિ શર્મા
5. ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ?
   A) સ્પાઈલર　B) સ્નાઈપર　C) સ્નુકર　D) સ્નિફર

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

6. પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ?
   A) હોકી　B) શતરંજ　C) તિરંદાજી　D) ક્રિકેટ
7. મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું?
   A) મુક્કાબાજી　B) કબડ્ડી　C) કુસ્તી　D) દોડ

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

8. કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ?
   A) ગાવસ્કર　B) શ્રીસંત　C) ધોની　D) તેંડુલકર

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

9. 'પ્લેઈંગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ?
   A) સાનિયા મિર્ઝા　B) સાનિયા નેહવાલ
   C) મહેન્દ્રસિંહ ધોની　D) સચીન તેંડુલકર

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

10. ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ?
    A) કાનપુર　B) મોહાલી　C) કલકત્તા　D) બેંગલોર

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

11. વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ?
    A) વિરેન્દ્ર સહેવાગ　B) મહેન્દ્રસિંહ ધોની
    C) સચિન તેંડુલકર　D) એબી ડી વિલીયર્સ

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

12. રણજી ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ?
    A) એસ. મંજરેકર　B) વી. મર્ચન્ટ
    C) ચેતેશ્વર પુજારા　D) બી.બી. નિમ્બાલકર

PSI GK - 1/1/2017

13. રિયો ઓલિમ્પિક-2016માં ભારતે કેટલા પદક જીત્યા ?
    A) 2 રજત　B) 1 રજત અને 1 કાંસ્ય
    C) 2 કાંસ્ય　D) 1 સુવર્ણ અને 1 કાંસ્ય
14. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?
    A) ઈંગ્લેન્ડ　B) ઓસ્ટ્રેલિયા　C) પાકિસ્તાન　D) વેસ્ટ ઈન્ડિઝ
15. નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ?
    A) 16　B) 18　C) 20　D) 22

1)B, 2)D, 3)C, 4)D, 5)B, 6)A, 7)D, 8)D, 9)D, 10)A, 11)D, 12)D, 13)B, 14)D, 15)B.

16. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ક્યો છે ?
A) લોન ટેનિસ કોર્ટ B) બેડમિન્ટન કોર્ટ
C) સ્ક્વેશ કોર્ટ D) બાસ્કેટ બોલ કોર્ટ

PSI GK - 4-3/5-3/2017

17. રિયો પેરા ઓલિમ્પિકનાં કઈ રમતમાં દેવેન્દ્ર જાજરીયાએ સૂવર્ણ ચંદ્રક જીત્યો હતો ?
A) ડિસ્કસ થ્રો B) શોટ પુટ C) જેવલીન થ્રો D) હેમર થ્રો
18. રિયો ઓલમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ?
A) અદિતી અશોક B) દિપીકા લહરી
C) સાક્ષી સૉનેવાલ D) ગંજમ શ્રીવાસ્તવ
19. જલ્લીકટ્ટુ એટલે શું ?
A) બળદ આધારિત એક રમત B) એક પ્રાર્થના
C) તારવાની એક સ્પર્ધા D) બોક્સીંગ સ્પર્ધા
20. ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. તે કઈ રમત રમતા હતાં?
A) બેડમિંટન B) કબડ્ડી C) હોકી D) ફૂટબોલ
21. નીચેનામાંથી સૌથી નાનું શું છે ?
A) ક્રિકેટ બૉલ B) હોકી બોલ C) સ્ક્વોશ બૉલ D) ટેનિસ બૉલ
22. ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ ક્યા રાજ્યનાં છે ?
A) કેરળ B) તમિલનાડુ C) આંધ્ર પ્રદેશ D) તેલંગાણા

કોન્સ્ટેબલ - 23/10/2016

23. કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
A) પી.વી. સંધુ B) સાક્ષી મલિક
C) ગીતા ફોગટ D) દીપીકા કુમારી
24. પેરા ઓલમ્પીક ગેમ્સ-2016માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ?
A) ઊંચી કૂદ B) શોટ પુટ (ગોળા ફેંક)
C) ભાલા ફેંક (જેવીલીન થ્રો) D) લાંબી કૂદ
25. ક્યા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?
A) દેવેન્દ્ર જાજરીયા B) મેરીયપન તેગવેલુ
C) વરૂણ ભાટી D) રાજેન્દ્રસિંહ રાહેલુ
26. રીઓ ઓલમ્પીક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ ક્યા દેશના વતની છે ?
A) અમેરિકા B) જમૈકા
C) સાઉથી આફ્રીકા D) ઈંગ્લેન્ડ
27. 2020ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજાનાર છે ?
A) ટોકીયો B) વોશિંગ્ટન C) શાંઘાઈ D) મોસ્કો

બિન સચિવાલય કલાર્ક - 2016

28. ઓલિમ્પિક - 2016 ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક ક્યા રાજયના વતની છે ?
A) પંજાબ B) દિલ્હી C) મદ્રાસ D) હરિયાણા

બિન સચિવાલય કલાર્ક - 21/12/2014

29. આવનારા વર્ષ 2018માં એશિયન ગેમ્સ ક્યા દેશમાં રમાશે?
A) મ્યાનમાર (બર્મા) B) ઈન્ડોનેશિયા
C) નોર્થ કોરિયા D) મલેશિયા

GPSC પ્રિલિમ - 2001

30. "ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ?
A) ક્રિકેટ B) હોકી C) કુસ્તી D) ફુટબોલ

GPSC પ્રિલિમ - 2007

31. 'ફોર્મ્યુલા વન' સંબોધન કઈ રમતમાં વપરાય છે ?
A) મોટર રેસિંગ B) બાસ્કેટ બોલ C) સ્કેટિંગ D) નૌકા રેસ
32. ટાઈગર વુડ્ઝને કઈ રમત સાથે સંબંધ છે ?
A) ટેનિસ B) ગોલ્ફ C) કાર રેસિંગ D) સ્કેટિંગ
33. આમાં કોણ જુદું પડે છે ?
A) સેન્ટર ફોરવર્ડ B) વિકેટ કીપર
C) પેનલ્ટી D) ગોલકીપર
34. આમાંથી ચેસ (શતરંજ)ની ખેલાડી કોણ છે ?
A) શીખા ઓબેરોય B) ડાયના એડુલજી
C) શાઈની વિલિયમ્સ D) કોનેરુ હમ્પી
35. 'દૂસરા' શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ?
A) ક્રિકેટ B) ફૂટબોલ C) હોકી D) બેડમિન્ટન
36. પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?
A) બેંગકોક B) જાકાર્તા C) દિલ્હી D) તેહરાન

GPSC પ્રિલિમ - 2014

37. ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર-પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ ?
A) 18 વાર B) 36 વાર C) 30 વાર D) 22 વાર

16)C, 17)C, 18)A, 19)A, 20)C, 21)C, 22)B, 23)B, 24)B, 25)A, 26)B, 27)A, 28)D, 29)B, 30)A, 31)A, 32)B, 33)B, 34)D, 35)A, 36)C, 37)D.

38. વર્ષ 2020માં ઓલિમ્પિક રમતો ક્યાં યોજાશે ?
A)દુબઈ B)ટોકિયો
C)ગ્લાસગો D)રિયો-ડી-જાનેરો

PSI ખાતાકીય - 23/04/2017

39. સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે?
A)ટેબલ ટેનિસ B)લૉન ટેનિસ
C)બેડમિન્ટન D)આર્ચરી

40. ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?
A)બેંગ્લોર B)કલકત્તા C)મદ્રાસ D)હૈદરાબાદ

41. તાજેતરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી ક્યા શહેરનો નિવાસી છે ?
A)નવસારી B)રાજકોટ C)આણંદ D)સુરત

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

42. રીયો પેરાઓલેમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે?
A)સુનિલ કુમાર B)દેવેન્દ્ર જાજરિયા
C)સાક્ષી મલિક D)પી.વી.સિંધુ

PSI/ASI GK - 2/5/2015

43. શતરંજના જન્મદાતા દેશ કયો છે ?
A)યુ.એસ.એ. B)રશિયા C)ભારત D)ઈંગ્લેન્ડ

44. પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ?
A)પ્રુડેન્શીયલ કપ B)કોકો કોલા કપ
C)રિલાયન્સ કપ D)વિલ્સ કપ

45. નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?
A)અંજલી ભાગવત B)સાનિયા નેહવાલ
C)સાનિયા મિર્ઝા D)કિરણ શેખાવત

46. ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ?
A)1879 ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ
B)1877 ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ
C)1879 ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા
D)1880 ઈંગ્લેન્ડ-વેસ્ટઈન્ડીઝ

47. લંડન ઓલિમ્પિક - 2012માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ?
A)3 B)6 C)4 D)5

48. ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યા દેશ સામે 100મી સદી નોંધાવી હતી ?
A)શ્રીલંકા B)પાકિસ્તાન C)બાંગ્લાદેશ D)ઓસ્ટ્રેલિયા

49. સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
A)સ્વિમિંગ B)વેઈટલીફ્ટિંગ
C)કુસ્તી D)બેડમિન્ટન

GPSC Class-1 - 2016

50. કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે ?
A)ક્રિકેટ B)હોકી
C)ટેબલ-ટેનીસ D)વેઈટલીફટીંગ

51. ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં "પોલો" રમતનો આરંભ થયો ?
A)મણીપુર D)પંજાબ C)હરિયાણા D)રાજસ્થાન

52. ભારતની સૌ પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની કોણ હતા ?
A)કપિલદેવ B)અજિત વાડેકર
C)સુનીલ ગાવસ્કર D)સંદીપ પાટીલ

53. ભારતે હોકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે પ્રાપ્ત કર્યો હતો?
A)1928 B)1932 C)1936 D)1948

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

54. 2016 માં ઓલમ્પીકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવનાર ભારતની કઈ મહિલાઓ છે?
1) સાક્ષી મલીક 2) પી.વી.સીંધુ
3) દીપા કરમરકર
A)માત્ર 1 અને 3 B)માત્ર 2 અને 3
C)1 અને 2 D)1, 2 અને 3 પૈકી કોઈપણ નહી

GPSC Class - 2 - 29/1/2017

55. નીચે દર્શાવેલ કઈ જોડ સાચી નથી?
A)બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા
B)શતરંજ - અશોક પંચાલ
C)400 મીટર દોડ - ચાર્લ્સ
D)શતરંજ (ચેસ) - સતીષ મોહન

56. દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે?
A)રિહેન મહેતા B)નાથુરામ પહાડે
C)માના પટેલ D)કલ્યાણી સક્સેના

38)B, 39)C, 40)B, 41)C, 42)B, 43)C, 44)A, 45)A, 46)B, 47)B, 48)C, 49)C, 50)D, 51)A, 52)B, 53)A, 54)C, 55)D, 56)B.

57. સોમદેવ દેવવર્મને કઈ રમતમાંથી સંન્યાસ લીધો?
A)ટેનિસ B)ફૂટબોલ C)વોલીબોલ D)હોકી

58. દિપા મલિક કઈ રમત સાથે સંબંધિત છે?
A)એરોબિક્સ B)એથ્લેટિક્સ
C)તિરંદાજી D)ઉપર પૈકી એકપણ નહી

59. "એટ ધી ક્લોઝ ઓફ પ્લે" નામની આત્મકથા નીચેના પૈકી કોની છે?
A)યુવરાજસિંહ B)રાહુલ દ્રવિડ
C)સ્ટીવ વો D)રિકી પોંટિંગ

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

60. ક્યા વર્ષમાં એશિયન ગેમ્સ સૌપ્રથમ વખત યોજાઈ ?
A)1936 B)1982 C)1951 D)1948

61. એશિયન ગેમ્સ 2014 માં કેટલા દેશોએ ભાગ લીધો હતો?
A)45 B)51 C)42 D)37

62. રમતગમતના સાધનોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે:
A)પંજાબ B)કર્ણાટક C)આંધ્રપ્રદેશ D)ઉત્તરપ્રદેશ

63. કયા ભારતીય ટેનિસ ખેલાડીએ એક વખત ATP વિમેન્સ ડબલ ટેનિસ રેન્કીંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું?
A)સાનીયા મિરઝા B)સાનીયા નેહવાલ
C)જીમ યોંગ D)ગુરૂદયાલ સિંહ

GPSC Class - 2 - 18/12/2016

64. અનિર્બાન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે?
A)બોક્સિંગ B)કુસ્તી C)ગોલ્ફ D)કબડ્ડી

65. બંપ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે?
A)બાસ્કેટબોલ B)બેસબોલ C)ક્રિકેટ D)હોકી

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

66. રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો?
A)થાંગાવેલુ મરીઅપ્પન B)દિપા મલીક
C)દેવેન્દ્ર ઝાઝરીયા D)મુરલીકાન્ત પેટકર

67. ઓલિમ્પિકસ 2016 ક્યાં યોજાઈ હતી?
A)પેરીસ B)રીયો-ડી-જાનેરો
C)ચીન D)સીઓલ

68. 2018 એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાશે?
A)ભારત B)ચીન C)ઈન્ડોનેશીયા D) જર્મની

GPSC Class - 2 - 12/2/2017

69. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યક્તિની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુકતી કરેલ છે?
A)દિપીકા કેલ B)નેપોલીયન સીંધ
C)સતીંદર શર્મા D)દુર્ગા ઠકુર

70. ઈન્ટરનેશનલ બોકસીંગ એસોસીયેશન એમ્બેસેડર (International Boxing Association Ambassador) તરીકે હાલમાં સ્ત્રીઓની બોકસીંગ સ્પર્ધા માટે કોની નિમણૂંક થયેલ છે?
A)અખીલ કુમાર B)મેરી કોમ
C)મહમદઅલી કોમર D)વિજેન્દ્ર સીંગ

GPSC Class - 2 - 28/1/2017

71. ફૂલ સાઈઝ ઓલિમ્પિક રમતોના ધ્વજ (Full Size Olympic Flag) ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે.
A)3 મીટર અને 2 મીટર B)5 મીટર અને 3 મીટર
C)2 મીટર અને 1 મીટર D)3 મીટર અને 3 મીટર

72. ઈંગ્લીશ ચેનલ તરીને પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા?
A)આરતી પ્રધાન B)મિહીર સેન
C)દુર્ગા બેનરજી D)સુસ્મીતા સેન

73. સને 2020 ની સમર ઑલમ્પિક ગેમ્સ ક્યા સ્થળે આયોજીત થનાર છે?
A)ટોકીયો - જાપાન B)લંડન
C)બીજીંગ D)સીડની

GPSC Class-1 - 15/01/2017

74. ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ?
A)વર્ષ 2013 B)વર્ષ 2014 C)વર્ષ 2015 D)વર્ષ 2016

75. વર્ષ 2022માં રાષ્ટ્રીય રમતગમતોનું આયોજન કયા રાજયમાં થનાર છે?
A)ઉત્તરાખંડ B)આંધ્રપ્રદેશ C)મેઘાલય D)છત્તીસગઢ

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

76. વિશ્વની સૌથી ઝડપી મહિલા દોડવીર ફ્લોરેન્સ ગ્રીફીથ જોયનાર દ્વારા કયા વર્ષમાં સ્થાપવામાં આવેલ 100 મીટર દોડનો વિશ્વવિક્રમ હજુ આજ દિન સુધી તૂટ્યો નથી ?
A)1984 B)1988 C)1996 D)2004

57)A, 58)B, 59)D, 60)C, 61)A, 62)A, 63)A, 64)C, 65)C, 66)C, 67)B, 68)C, 69)D, 70)B, 71)A, 72)B, 73)A, 74)C, 75)C, 76)B.

77. "લ્યુગ" કઈ રમત છે ?
A)બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત
B)એક પ્રકારની તરણ સ્પર્ધા છે
C)હોકીની રમતનું બીજુ નામ છે
D)અશ્વદોડ

78. "કબ્બડી" રમતને સૌ પ્રથમ વાર ક્યા ઓલિમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ?
A)1990 B)2016
C)2012
D)હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી.

79. સાઈની અબ્રાહમનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?
A)મહિલા ક્રિકેટ B)હોકી
C)કુસ્તી D)એથ્લેટીક્સ

80. રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં ક્યા મહિલા ખેલાડીની રાજ્યસભામાં નિમણૂંક કરવામાં આવી છે ?
A)સાનિયા મિર્ઝા B)સાઈના નહેવાલ
C)મેરી કોમ D)પી.વી. સિંધુ

81. પેરાલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
A)દિપા મલિક B)શશી મલિક
C)સત્તી ગીધા D)ઉપરના પૈકી કોઈ નહીં

82. વિશ્વમાં હાલ સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડીયમનું સૂચિત આયોજન ક્યાં રાજ્યમાં થયેલ છે ?
A)ગુજરાત B)પશ્ચિમ બંગાળ
C)કર્ણાટક D)મહારાષ્ટ્ર

GPSC Class - 2 - 16/04/2017

83. ભારતને પ્રથમ હોકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ ક્યા વર્ષમાં મળેલ હતું?
A)1948 B)1936 C)1932 D)1928

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

84. કબડી વર્લ્ડકપ-2016માં ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું છે?
A)અજયકુમાર B)અનુપકુમાર
C)યોગેશકુમાર D)રાહુલ ચૌધરી

85. માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?
A)ટેબલ ટેનિસ B)લોન ટેનિસ C)શૂટિંગ D)સ્વીમીંગ

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

86. સ્લેમ ડંક ફ્રી થ્રો, બોનસ, બ્લેક બોર્ડ શબ્દો કઈ રમત સાથે જોડાયેલ છે ?
A)ટેનિસ B)બાસ્કેટ બોલ C)ફૂટબોલ D)બેઝબોલ

87. રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું ક્યું જોડકું સાચું નથી?
1) સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ
2) સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ
3) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી
4) છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ)
A)4 B)3 C)2 D)1

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

88. "પ્રોડુનોવા" નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે?
A)બિલિયર્ડ્સ B)હોકી C)જિમ્નેસ્ટીક્સ D) રગબી

89. નીચેના પૈકી કયું શહેર પુરૂષોની હોકી વર્લ્ડ કપ 2018 ની યજમાની કરશે?
A)નવી દિલ્હી B)હૈદ્રાબાદ C)બેંગ્લૂર D)ભુવનેશ્વર

GPSC Class - 2 - 18/03/2017

90. વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે?
A)સ્વીમીંગ B)બોક્સીંગ
C)લાંબો કૂદકો D)ઉંચો કૂદકો

91. રમત અને તેની એક ટીમમાં સભ્યોની સંખ્યાને યોગ્ય રીતે ગોઠવો.

1) પોલો	A)1
2) વોલીબોલ	B)2
3) બ્રીજ	C)6
4) ચેસ	D)4

A)1-D, 2-C, 3-B, 4-A B)1-C, 2-B, 3-A, 4-D
C)1-D, 2-B, 3-A, 4-C D)1-B, 2-A, 3-C, 4-D

92. કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે?
A)ટેનિસ B)બોક્સીંગ C)બેડમિન્ટન D)હોકી

93. "જીવ મિલ્ખા સિંઘ" કઈ રમત સાથે સંકળાયેલ છે?
A)વોલીબોલ B)ગોલ્ફ C)દોડ D)હોકી

94. પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલાં છે?
A)ફુટબોલ B)હોકી C)વોલીબોલ D)ટેનિસ

95. નીચેના પૈકી કયો કપ/ટ્રોફી પોલો રમત સાથે સંકળાયેલ છે?
A)ડેવીસ કપ B)ચેમ્પીયન ટ્રોફી
C)રાધા મોહન કપ D)દેવધર ટ્રોફી

96. સને 2018 ની "એશિયન ગેમ્સ" ક્યા દેશમાં રમાનાર છે?
A)કતાર B)ચીન
C)સાઉથ કોરીયા D)ઈન્ડોનેશિયા

97. સામાન્ય રીતે કબડી માટે રમતના મેદાન માટે કેટલી જગ્યા જરૂરી છે?
A)$12\frac{1}{2}$ મીટર × 10 મીટર B)15 મીટર × 12 મીટર
C)8 મીટર × 6 મીટર D)9 મીટર × 6 મીટર

77)A, 78)D, 79)D, 80)C, 81)A, 82)A, 83)D, 84)B, 85)A, 86)B, 87)A, 88)C, 89)D, 90)B, 91)A, 92)B, 93)B, 94)A, 95)C, 96)D, 97)A.

GPSC Class - 1 - 28/01/2017

98. નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી?
A)ડુરાન્ડ કપ - ફૂટબોલ B) વિલિંગ્ટન કપ - લોન ટેનિસ
C)ડેવિસ કપ - લોન ટેનિસ D)રંગાસ્વામી કપ - હોકી
99. ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી?
A)18 વર્ષ B)20 વર્ષ C) 17 વર્ષ D) 16 વર્ષ

નાયબ ચિટનીશ - 02/06/2015

100. ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 નો યજમાન દેશ કયો હતો?
A)બાંગ્લાદેશ B) ઈંગ્લેન્ડ
C)દક્ષિણ આફ્રિકા D) ન્યુઝિલેન્ડ
101. 'કર્નલ' ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે?
A)રવિ શાસ્ત્રી B) કપિલ દેવ
C)દિલિપ વેંગસકર D)હરભજનસિંહ

નાયબ ચિટનીશ - 05/02/2017

102. રણજી ટ્રોફી' જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?
A)રાજકોટ B)વડોદરા C) ભાવનગર D)જામનગર

GPSC Class - 2 - 16/04/2017

103. અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો?
A)સુભાષ ગુપ્તે B) એમ.એલ.જયસીમ્હા
C)લાલા અમરનાથ D) રમણ લાંબા
104. રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી?
A)શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ B) દિપા કરમાકર : જિમ્નેસ્ટિક્સ
C)વિકાસ ગોંવડા : દોડ D) પી.આર. શ્રીજેશ : હોકી
105. નીચેના પૈકી કયો 'કપ/ટ્રોફી' ફુટબોલની રમત સાથે સંકળાયેલ નથી?
A)સંતોષ ટ્રોફી B) એશિયા કપ
C)ફેડરેશન કપ D) ઈરાની કપ

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

106. સૌથી ઓછી વયમાં (ઉમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ?
A)અદીતી અશોક B) દીપા કર્માકર
C)સાક્ષી મલીક D) પી.વી.સિંધુ
107. ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ?
A)ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે
B) રણજી ટ્રોફી ચેમ્પીયન અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે
C) વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે
D)અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે
108. એશીયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સૂવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
A)એમ.એલ. વલસમ્મા B) પી.ટી. ઉષા
C) કમલજીત સંધુ D) કે.માલેશ્વરી
109. ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ?
A)21 નોટીકલ માઈલ અને 16 નોટીકલ માઈલ
B) 14 નોટીકલ માઈલ અને 7 નોટીકલ માઈલ
C) 10 નોટીકલ માઈલ અને 5 નોટીકલ માઈલ
D)7 નોટીકલ માઈલ અને 4 નોટીકલ માઈલ

GPSC Class - 2 - 04/03/2017

110. ફીફા વર્લ્ડકપ-2018નું મેસ્કોટ 'ઝાબીવાકા' કયું પ્રાણી છે ?
A)વરૂ B) ગેંડો C) સફેદ હાથી D) સફેદ વાઘ

GPSC Class - 2 - 18/03/2017

111. નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલ્મ્પિકમાં સ્થાન પામેલ છે ?
A)બીચ વોલીબોલ B) ગોલ્ફ
C)સાઈક્લીંગ D)ટેઈકવોન્ડો
112. રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?
A) 1985 B) 1990 C) 1992 D) 1987
113. વર્ષ 2016નો રાજીવ રત્ન ખેલ એવોર્ડ જીતુ રાયને કઈ રમતમાં મળેલ છે ?
A)બેડમિન્ટન B) જીમ્નેસ્ટીક્સ C) શૂટીંગ D) કુસ્તી
114. ધી કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોર્ટસનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ?
A)રશિયા B) સ્વીટઝર્લેન્ડ C) ચીન D) જાપાન
115. એશિયન ગેઈમ્સ, 2014માં અભિષેક વર્માને સુવર્ણચંદ્રક શામાં મળેલ હતો ?
A)પિસ્તોલ શૂટીંગ B) કુસ્તી
C) તીરંદાજી D) તરણસ્પર્ધા

98)B, 99)D, 100)D, 101)C, 102)D, 103)D, 104)C, 105)D, 106)D, 107)B, 108)C, 109)A, 110)A, 111)B, 112)A, 113)C, 114)B, 115)C.

116. વર્ષ 2016માં અઝારબૈઝાનમાં આયોજિત જૂનિયર વર્લ્ડકપ શુટિંગમાં ક્યા ગુજરાતી ખેલાડીએ સુવર્ણચંદ્રક મેળવેલ છે ?
A) અંશુલ કોઠારી B) કિરણ પરમાર
C) સ્મિત શર્મા D) ઋષિરાજ બારોટ

117. કિરણ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
A) કબડ્ડી B) ટેબલ ટેનિસ C) સ્ક્વોશ D) સ્નૂકર

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

118. રિયો ઓલિમ્પિક, 2016માં ભારતે ...... મેડલ મેળવીને ..... નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું ?
A) 2, 60 B) 2, 65 C) 3, 68 D) 2, 67

119. ખેલ મહાકુંભ, 2016 અંતર્ગત રાજ્યમાં પ્રથમ ત્રણ આવનાર શાખાઓને અનુક્રમે ઈનામ પેટે શું આપવાનું ધોરણ નક્કી કરવામાં આવેલ હતું ?
A) રૂ.4 લાખ, રૂ.2.50 લાખ, રૂ.1.50 લાખ
B) રૂ.5 લાખ, રૂપિયા 3 લાખ, રૂ.2 લાખ
C) રૂ.3 લાખ, રૂ.2 લાખ, રૂ.1 લાખ
D) રૂ.1.5 લાખ, રૂ.1 લાખ રૂ.75 હજાર

120. ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી ?
A) ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી
B) ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ-મે અને જૂન
C) વિમ્બલ્ડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ
D) યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ- સપ્ટેમ્બર અને ઓક્ટોબર

121. ખેલ મહાકુંભ 2016માં કુલ........રમતોનો સમાવેશ કરવામાં આવેલ હતો ?
A) 30 B) 28 C) 24 D) 26

122. રિયો પેરા ઓલમ્પિકમાં ભારતને કુલ કેટલા ચંદ્રકો મળેલ છે ?
A) 10 B) 6 C) 4 D) 12

123. રિયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કુદમાં સુવર્ણ ચન્દ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલિમ્પિયન ખેલાડી કોણ છે ?
A) દિપા મલીક B) દેવેન્દ્ર ઝાઝરિયા
C) મરીયપ્પન થંગાવેલુ D) જોગીન્દરસિંગ બેદી

GPSC Class - 2 - 5/3/2017

124. નીચેનાં વાક્યો પૈકી ક્યા વાક્યો સાચા છે ?
1. બેઝબોલની રમતમાં 9 ખેલાડીઓ છે.
2. હોકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે.
3. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે
ઉપરોક્ત વાક્યો એક ટીમને લાગું પડે છે.
A) 1, 2 B) 1, 3
C) 1, 2, 3 D) એક પણ વાક્ય સાચું નથી.

GPSC Class - 2 - 11/12/2016

125. ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ : બોલ્ટ ક્યા દેશનો વતની છે ?
A) અમેરિકા B) બ્રિટન C) બ્રાઝિલ D) જમૈકા

126. ઓલિમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ?
A) ચાર B) પાંચ C) સાત D) આઠ

127. સામાન્ય રીતે ક્રિકેટની રમતની પીચની લંબાઈ કેટલી હોય છે?
A) 20.12 મીટર B) 12.20 મીટર
C) 18.12 મીટર D) 21.12 મીટર

128. ચેસના બોર્ડ ઉપર કુલ કેટલા ચોરસ હોય છે ?
A) 64 B) 81 C) 100 D) 49

129. એલી બેક કોર્ટ કેરી સેન્ટર લાઈન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ?
A) ક્રિકેટ B) ફૂટબોલ C) હોકી D) બેડમિન્ટન

130. ફન્ટકોલ, સ્પિથ બોર્ડ, બટર ફલાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ?
A) ક્રિકેટ B) હોકી C) બાસ્કેટ બોલ D) તરણ

131. વર્લ્ડ ઓલિમ્પિક એસોસિએશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ?
A) AAI B) IOA C) AOI D) OAI

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

132. વાનખેડે સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે ?
A) જયપુર B) દિલ્હી C) અમદાવાદ D) મુંબઈ

133. રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે ક્યો ચંદ્રક જીત્યો હતો ?
A) એક પણ નહીં B) કાંસ્ય ચંદ્રક
C) રજત ચંદ્રક D) સુવર્ણ ચંદ્રક

134. અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડકપમાં ક્યો દેશ ચેમ્પિયન બન્યો ?
A) બાંગ્લાદેશ B) ભારત C) પાકિસ્તાન D) ઈરાન

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

135. ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે ?
A) 30 મીટર x 30 મીટર B) 29 મીટર x 16 મીટર
C) 40 મીટર x 20 મીટર D) એકેય નહીં

116)D, 117)A, 118)D, 119)B, 120)D, 121)A, 122)C, 123)C, 124)C, 125)D, 126)B, 127)A, 128)A, 129)D, 130)D, 131)D, 132)D, 133)B, 134)B, 135)B.

136. ગોળાફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ?
A) બહાદુર સિંઘ B) મિલ્કા સિંઘ C) દારા સિંઘ D) એકેય નહીં

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

137. સ્મૃતિ મંધાના કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે?
A) કબડ્ડી B) ક્રિકેટ C) બાસ્કેટ બોલ D) હોકી

મુખ્ય સેવિકા - 8/1/2017

138. નીચે આપેલી રમતમાથી કઈ રમતનું મેદાન મોટું હોય છે ?
A) હોકી B) બાસ્કેટબોલ C) વોલીબોલ D) કબડ્ડી
139. કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ?
A) બચાવ પક્ષ B) બંને પક્ષ
C) ચઢાઈ કરનાર પક્ષ
D) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી.
140. પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ?
A) ચેતન ચૌહાણ B) પાર્થિવ પટેલ
C) ચેતેશ્વર પૂજારા D) વિનુ માંકડ

વિસ્તરણ અધિકારી - 7/1/2017

141. 2020માં ઓલિમ્પિક રમત ક્યાં રમાવાની છે ?
A) જાપાન B) ભારત C) ઓસ્ટ્રેલિયા D) શ્રીલંકા
142. કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ?
A) 1945 B) 1990 C) 1997 D) 1975

TET-II -2017

143. ગુજરાત સરકારે તાજેતરમાં જ પીપીપી ધોરણે તૈયાર કરેલ અમદાવાદ ખાતેનું આધુનિક સ્પોર્ટસ અને એન્ટરટેઈમેન્ટ કોમ્પ્લેક્સનું નામ શું છે ? - ટ્રાન્સ્ટેડિયા

HTAT - 2015

144. ડુક કૌશલ્ય કઈ રમતનું છે? : ખો-ખો

કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર - 1

145. અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ? - બેઝબોલ
146. મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટરની હોય છે ? - 42.195
147. બેક હેન્ડ, બેકસ્પીન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ? - ટેનિસ

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

148. ગુજરાતના આંતરરાષ્ટ્રીય શૂટીંગ સ્પર્ધાના એવોર્ડ વિજેતા કોણ છે ? - લજ્જા ગોસ્વામી

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

149. IPL એટલે શું ? - ઈન્ડિયન પ્રિમિયર લીગ

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

150. બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. - ગીત શેઠી

મહેસૂલી તલાટી - 2014

151. "ગ્રાન્ડ માસ્ટર" ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે ? - શતરંજ
152. ટી (Tee) શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? - ગોલ્ફ

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર ક્લાર્ક - 2012

153. 'શિવાજી સ્ટેડિયમ' ક્યાં આવેલ છે ? - દિલ્હી
154. 'કમલેશ મહેતા' કઈ રમત સાથે સંકળાયેલ છે ? - ટેબલ ટેનિસ
155. ફ્લાઈટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? - ક્રિકેટ

જૂનિયર ક્લાર્ક પેપર - 1 - 2012

156. પ્રથમ સાફ (SAF) રમતોત્સવ કયા વર્ષમાં રમાયો હતો ? - 1984
157. પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષમાં યોજાયો હતો ? - 1975

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

158. પેનલ્ટી કીક શબ્દ કઈ રમતમાં વપરાય છે? - ફૂટબોલ
159. મહાન ખેલાડી લીઓનેલ મેસી કઈ રમત સાથે સંકળાયેલા છે ? - ફૂટબોલ
160. નારાયણ કાર્તિકેયન કઈ રમત સાથે સંકળાયેલ છે ? - કાર રેસીંગ
161. રાષ્ટ્રમંડલ દેશોના રમતોત્સવમ ગુજરાતની કઈ મહિલા ખેલાડીએ 50 મીટર રાઈફલ શૂટિંગનો સિલ્વર મેડલ જીત્યો ? - લજ્જા ગોસ્વામી
162. પ્રસિધ્ધ ભારતીય મહિલા ખેલાડી સાયના નેહવાલનું નામ નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલું છે ? - બેડમિન્ટન
163. વર્તમાન સમયમાં કુસ્તીના પ્રત્યેક મુકાબલાનો સમય કેટલી મિનિટનો હોય છે? - 9 મિનિટ

નાયબ મામલતદાર/DY.S.o - 2012

164. વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? - કોનેરુ હમ્પી

136)A, 137)B, 138)A, 139)C, 140)D, 141)A, 142)B.

165. ભારતના કયા રાજયમાં દર વરસે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે? - **પંજાબ**

166. ભારતને કઈ રમતમાં વધુ ઓલિમ્પિક ચંદ્રકો મળ્યા છે? - **હૉકી**

167. રુપેશ શાહનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે? - **બિલિયર્ડ અને સ્નૂકર**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

168. સૌથી મોટા મેદાનની જરૂર..........રમતને પડે છે ? - **પોલો**

169. 3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ? - **બાસ્કેટ બોલ**

170. ઓલિમ્પિક રમતોત્સવમાં હોકીની રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર કેપ્ટનોને, ઓલિમ્પિકના કાળક્રમ અનુસાર મુકો. - **ધ્યાનચંદ - બલબીરસિંઘ - રચનજીતસિંઘ - શંકર લક્ષ્મણ**

171. કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ કઈ રમતમાં મેળવ્યા છે? - **સ્વીમીંગ**

સબરજિસ્ટ્રાર - 2013

172. લજ્જા ગોસ્વામી ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? - **શૂટીંગ રમતગમત**

173. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ? - હૉકી

174. સાઈના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? - બેડમિન્ટન

TAT - 2012

175. ....ભારત માટે પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. - **અભિનવ બિન્દ્રા**

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

176. પાર્થિવ પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે? - ક્રિકેટ

એકાઉન્ટ ઓફિસર - 1999

177. કઈ રમત ઘોડા પર બેસીને રમાય ? - **પોલો**

આંકડાકીય અધિકારી - 2000

178. ગીત શેઠી કઈ રમત સાથે સંકળાયેલ છે ? - **બિલિયર્ડ**

મેડિકલ ટ્યૂટર - 2000

179. એક જ મેચમાં ઓછા રન સાથે 10 વિકેટ ખેરવનાર ભારતીય ક્રિકેટર કોણ છે ? - **અનિલ કુંબલે**

આયુર્વેદિક ડોક્ટર - 2000

180. અભિનવ બિન્દ્રા કઈ રમત સાથે સંબંધિત છે ? - **નિશાનેબાજી (શૂટિંગ)**

181. આગાખાન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? - **હોકી**

182. બેટ્સમેન રમી ન શકે તેવા દૂર કે ઊંચો ફેંકાયેલા બોલને શું કહેવાય ? - ડેડબોલ

183. પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ ક્યા રમાઈ હતી ? - **લોર્ડ્સ (પ્રથમ વન-ડે મેચ 1971માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ખાતે રમાઈ હતી)**

વૈદકિય સેવા - 2000

184. બુલ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ? - **રાયફલ શૂટિંગ**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

185. રાજ્યવર્ધન રાઠોડ કઈ રમત સાથે સંબંધિત છે? **: રાઈફલ શૂટિંગ**

186. આધુનિક સમયમાં પ્રથમ ઓલિમ્પિક રમતો ક્યા સ્થળે યોજાઈ હતી ? - **એથેન્સ, 1896**

187. ઓલિમ્પિક રમતોત્સવ પ્રતિ કેટલા વર્ષે યોજાય છે? : 4

188. લિએન્ડર પેસ કઈ રમત સાથે સંબંધિત છે? : ટેનિસ

189. ક્રિકેટમાં જેના નામ પરથી રણજી ટ્રોફી રમાય છે, તે ક્રિકેટર ક્યા શહેરનો હતા ? : **જામનગર**

190. વોલી-હોફ વોલી શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ? - ટેનિસ

191. વિજય અમૃતરાજ કઈ રમત સાથે સંબંધ છે ? : ટેનિસ

192. સૌપ્રથમ વર્લ્ડ ઓલિમ્પિક રમતોત્સવ ક્યા યોજાયો હતો ? : **એથેન્સ**

193. ધનરાજ પિલ્લઈ કઈ રમત સાથે સંકળાયેલ છે? : હૉકી

194. હૂક પાસ શબ્દ કઈ રમત સાથે જોડાયેલો છે ? - બાસ્કેટ બોલ

195. આશુતોષ ટ્રોફી કઈ રમતમાં અપાય છે ? - ફૂટબોલ

196. ભારત તેની પ્રથમ વન-ડે ક્યાં દેશ સામે રમ્યું હતું ? : ઈંગ્લેન્ડ

197. હૉકી ઈન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી ? : 2009

198. ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? - **ફૂટબોલ**

199. કોમનવેલ્થ ગેમ્સ-2018 તથા ISSF વર્લ્ડકપ 2018માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે ? - **મનુ ભાકર**

200. સોનમ મલિક કઈ રમત સાથે સંબંધિત છે ? - **કુસ્તી**

201. કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા બનેલ ભારતીય ખેલાડી પુનમ યાદવ ક્યા રાજ્યના ખેલાડી છે? - **ઉત્તર પ્રદેશ**

202. અશ્રીત ધવન કપ કઈ રમત સાથે જોડાયેલો છે ? - બેડમિન્ટન

203. મહિલા આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર કોણ છે ? - **જુલન ગૌસ્વામી**

204. દેવધર ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે ? - ક્રિકેટ

205. બેટન કપ કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ? - **હોકી**

206. ઓલિમ્પિક રમતોના ચિહ્નમાં દર્શાવાતી પાંચ રિંગ (વર્તુળો) શેનું પ્રતિક છે ? - **પૃથ્વી પરના પાંચ ખંડ**

207. ગોવિન્દમ લક્ષ્મણન કઈ રમત સાથે સંકળાયેલ છે ? - **400 મીટર દોડ**

208. ટેનિસની રમતમાં માર્ટીના નાવરાતિલોવાનો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનો રેકોર્ડ કોણે તોડ્યો ? - **સેરેના વિલિયમ્સ**

209. આગામી ઓલિમ્પિક-2020ની સ્પર્ધા ક્યા દેશમાં યોજાવાની જાહેરાત કરવામાં આવી છે ? - **જાપાન**

210. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ (GFG)એ કઈ રમતના ખેલાડીઓ છે? : **કબડ્ડી**

211. ટેનિસની રમતમાં શાંઘાઈ માસ્ટર્સ ચેમ્પિયન ફેડરર ક્યા દેશ વતી રમે છે ? - **સ્વિત્ઝર્લેન્ડ**

212. અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ? - **બેઝબોલ**

213. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક દિવસીય મેચમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય સ્પીનરનું નામ શું છે ? - **કુલદીપ યાદવ**

214. અમી ધીયા શાહ કઈ રમત સાથે જોડાયેલ છે ? - **બેડમિન્ટન**

215. ક્યા ભારતીય બોલરોએ હેટ્રિક લીધેલી છે ?
- **કુલદીપ યાદવ, કપિલ દેવ, ચેતન શર્મા**

216. ગુજરાતી મીના પટેલ કઈ રમત સાથે સંબંધિત છે? - **સ્વિમિંગ**

217. ખો-ખો રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ? - **9**

218. ધ્યાની દવે કઈ રમત સાથે સંકળાયેલ છે ? - **ચેસ**

219. કિદામ્બી શ્રીકાંત રમત સાથે જોડાયેલ છે. - **બેડમિન્ટન**

220. ઈરાની કપ કઈ રમત સાથે સંબંધિત છે? - **ક્રિકેટ**

221. થોમસ કપ રમત સાથે સંબંધિત છે ? - **બેડમિન્ટન**

222. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ક્યા સ્થળે આવેલ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ ? - **ખંઢેરી ખાતે**

223. સેલેના સલવાકુમારેનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે ?
- **ટેબલ ટેનિસ**

224. સુલતાન અઝલન શાહ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- **હોકી**

225. મેરીકોમ બોક્સિંગ સાથે તો મનુ ભાકર...? - **શૂટિંગ**

226. બી.સી.ગુપ્તા ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે ?
- **બાસ્કેટ બોલ**

227. વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ કઈ રમત સાથે જોડાયેલ છે ? - **ટેનિસ**

228. ડ્યુરેન્ડ કપને કઈ રમત સાથે સંબંધ છે? - **ફૂટબોલ**

229. ગુજરાતી હર્મિત દેસાઈ કઈ રમત સાથે જોડાયેલા છે ? - **ટેબલ ટેનિસ**

230. એશિયન રમતોત્સવ સૌપ્રથમ ક્યા દેશમાં યોજવામાં આવેલ?
: **ભારત**

231. મેરેથોન દોડનું કુલ અંતર કેટલું હોય છે? : **42.195 કિ.મી.**

232. પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ? : **ગ્રીસના રાજા કિંગ જ્યોર્જ**

233. કોમનવેલ્થ ગેમ્સ 2018નું ક્યા સ્થળે આયોજન કરવામાં આવ્યું?
- **ગોલ્ડ કોસ્ટ**

234. ભારતનો ક્યો ખેલાડી શૂટિંગની રમતમાં 'ડબલ ટ્રેપ'ના ઈવેન્ટમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યો ? - **અંકુર મિત્તલ**

235. મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલ છે? : **ટેનિસ**

236. ગુજરાતી રમતવીર લજ્જા ગોસ્વામી કઈ રમત સાથે જોડાયેલ છે? - **રાયફલ શૂટિંગ**

237. ગુજરાતી અંકિત રાજપરા કઈ રમત સાથે જોડાયેલ છે ? - **ચેસ**

238. યુરોપીય રેસિંગ ચેમ્પિયનશિપમાં જીત મેળવનાર મહાવીર રઘુનાથન પહેલા ભારતીય છે તેઓ ક્યા પ્રદેશ સાથે સંબંધિત છે? - **તમિલનાડુ**

239. સુપ્રીયા જાટવ કઈ રમત સાથે સંબંધિત છે ? - **કરાટે**

240. 2020ની ઓલિમ્પિક ગેમ જાપાનના ટોક્યોમાં યોજાશે તો 2024ની રમત ક્યા યોજાશે ? - **પેરિસ (ફ્રાન્સ)**

241. ગુજરાતના રમતવીર ધ્યાની દવે ચેસમાં તો વિહાલા પરિતા...?
- **વોલીબોલ**

242. મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંબંધિત છે ? - **વેઈટ લિફ્ટિંગ**

243. 2028ની ઓલિમ્પિક ગેમ્સનું સૂચિત સ્થળ દર્શાવો.
- **લોસ એન્જલસ**

244. બાંદોડકર ગોલ્ડ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ? - **ફૂટબોલ**

245. ગુજરાતના સોહમ પંડ્યા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
- **ટેબલ ટેનિસ**

246. ગુજરાતના ખેલાડી કિરણ ડાભી કઈ રમત સાથે જોડાયેલા છે ?
- **બોડી બિલ્ડિંગ**

247. 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કઈ રમતમાં સૌથી વધુ ચંદ્રકો જીત્યા ? - **શૂટિંગ**

પુરસ્કાર

રેવન્યૂ તલાટી - 28/02/2016

1. ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?
   A)જ્ઞાનચંદ જૈન પરિવાર B)અભ્યંકર જૈન પરિવાર
   C)સાહુ જૈન પરિવાર D)જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

2. ગુજરાત સાહિત્ય સભા દ્વારા ક્યો પુરસ્કાર અપાય છે ?
   A)રણજિતરામ સુવર્ણચંદ્રક B)પ્રેમાનંદ ચંદ્રક
   C)જ્ઞાનપીઠ પુરસ્કાર D)નર્મદ ચંદ્રક

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

3. ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર ક્યો ગણાય છે ?
   A)ભારતરત્ન B)પદ્મભૂષણ
   C)પરમવીર ચક્ર D)પદ્મશ્રી
4. રવીન્દ્રનાથ ટાગોરના ક્યા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?
   A)ગીતા-ગુર્જરી B)ગીતમાધુરી
   C)ગીત-ગુર્જરી D)ગીતાંજલિ

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

5. ભારતરત્ન મેળનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?
   A)ડૉ.ભગવાનદાસ B)જવાહરલાલ નેહરુ
   C)ડૉ.એસ.રાધાકૃષ્ણન D)ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
6. નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?
   A)પન્નાલાલ પટેલ B)રાજેન્દ્ર શાહ
   C)લાભશંકર ઠાકર D)ઉમાશંકર જોષી

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

7. વર્ષ 2005 માટે ગુજરાતના ક્યા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ?
   A)પંકજ અડવાણી B)વિક્રમ સોલંકી
   C)રવીન્દ્ર જાડેજા D)ઈરફાન પઠાણ
8. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતી ?
   A)અમૃતા પ્રીતમ B)આશાપૂર્ણા દેવી
   C)એસ્થર ડેવિડ D)અમૃતા શેરગીલ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

9. ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?
   A)જ્યોતીન્દ્ર દવે B)ધનસુખલાલ મહેતા
   C)રમણલાલ નીલકંઠ D)રમણલાલ સોની
10. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી ક્યો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
   A)શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર
   B)ગુજરાત પુરસ્કાર
   C)જયભિખ્ખુ પુરસ્કાર
   D)ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

GPSC પેપર - 2 - 2017

11. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?
   A)Council for scientific and industrial Research
   B)Indian Institute of Science
   C)Uniersity Grants Commission
   D)Defence Research and Development Organization
12. વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ?
   A)આગાખાન એવોર્ડ B)એબેલ એવોર્ડ
   C)મેન બુકર પ્રાઈઝ D)યુનેસ્કો કલીંગ એવોર્ડ

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

13. નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.
   1. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે.
   2. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે.
   3. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
   A)વિધાન 1 અને 2 સાચા છે B)વિધાન 2 અને 3 સાચા છે
   C)વિધાન 1, 2 અને 3 સાચા છે D)વિધાન 2 અને 3 ખોટા છે

1)C, 2)A, 3)A, 4)D, 5)C, 6)C, 7)A, 8)B, 9)D, 10)D, 11)A, 12)D, 13)D.

14. 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ?
A) રઘુવીર ચૌધરી B) પ્રતિભા રાય
C) ભાલચન્દ્ર નેમાડે D) કેદારનાથ સિંઘ

કોન્સ્ટેબલ - 2015

15. કૈલાશ સત્યાર્થીને ક્યા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?
A) બાળમજૂરોને છોડાવવા
B) સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
C) પત્રકારત્વના ક્ષેત્રમાં
D) પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા

બિન સચિવાલય ક્લાર્ક - 2016

16. ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
A) પદ્મશ્રી B) પદ્મવિભૂષણ
C) પદ્મભૂષણ D) સંગીતરત્ન

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

17. અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?
A) જીવાવરણ B) મૃદાવરણ C) પર્યાવરણ D) વન્યજીવો

18. ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી?
A) કવિ નર્મદ B) રાજેન્દ્ર શાહ
C) પન્નાલાલ પટેલ D) ઉમાશંકર જોષી

19. ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ ક્યા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો?
A) ઝવેરચંદ મેઘાણી B) અવિનાશ વ્યાસ
C) કનૈયાલાલ મુનશી D) પન્નાલાલ પટેલ

GPSC પ્રિલિમ - 2007

20. "દાદા સાહેબ ફાળકે' એવોર્ડ ક્યા ક્ષેત્રમાં અપાય છે ?
A) સાહિત્ય B) સંગીત
C) ફિલ્મ D) રેડિયો કાર્યક્રમ

PSI/ASI GK - 2/5/2015

21. ક્યા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ?
A) પૃથ્વીરાજ કપુર B) દેવીકા રાણી
C) કાનન દેવી D) બી.એન.સરકાર

22. મૂર્તિદેવી એવોર્ડ ક્યા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
A) શાસ્ત્રીય સંગીત B) રંગમંચ લક્ષી કલા
C) પત્રકારત્વ D) સાહિત્ય

GPSC Class-1 - 2016

23. ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી ક્યા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલો?
A) પત્રકારત્વ B) સાહિત્ય અને શિક્ષણ
C) ન્યૂરોલોજી D) સર્જરી

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

24. અર્જુન એવોર્ડ ની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે?
A) 1961 અને રૂા. 5,00,000
B) 1961 અને રૂા. 7,50,000
C) 1971 અને રૂા. 1,00,000
D) 1981 અને રૂા. 2,00,000

GPSC Class - 2 - 28/1/2017

25. નોબલ પ્રાઈઝ (Nobel Prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?
A) રવીન્દ્રનાથ ટાગોર (Ravindranath Tagore)
B) સી.વી.રમન (C.V. Raman)
C) અમર્ત્ય સેન (Amartya Sen)
D) ઉપરોક્ત પૈકી એકપણ નહી

GPSC Class - 2 - 12/2/2017

26. સને 2017 માં કેટલો મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે?
A) 4 B) 5 C) 6 D) 7

14)A, 15)A, 16)A, 17)D, 18)A, 19)A, 20)C, 21)B, 22)D, 23)B, 24)A, 25)A, 26)D.

GPSC Class-1 - 15/01/2017

27. નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.
A) શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર
B) શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર
C) શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર
D) શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર

28. નીચે દર્શાવેલ વ્યકિતઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.
A) શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
B) શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
C) શ્રી પંડિત રવિશંકર D) ડૉ.ડી.વિરેન્દ્ર હેગડે

GPSC Class-1 - 15/01/2017

29. એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?
A) રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
B) આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
C) રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
D) જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

30. તાજેતરમાં ક્યા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે?
A) ટી.એમ. કૃષ્ણા B) બેજવાડા વિલ્સન
C) મહાદેવ વર્મા D) રઘુવીર ચૌધરી

GPSC Class - 2 - 16/04/2017

31. નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી?
A) અર્થશાસ્ત્ર B) રમત ગમત
C) સાહિત્ય D) શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

32. ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે?
A) સમાજસેવા માટે પારંપારીક જ્ઞાનનો ઉપયોગ
B) ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન
C) આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
D) સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

33. 2016 ની જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
A) મહાશ્વેતા દેવી B) નિરેન્દ્રનાથ ચક્રબોર્તી
C) રઘુવીર ચૌધરી D) શંખ ઘોષ

34. કયા ભારતીય પત્રકારને ઈન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?
A) પ્રણવ રોય B) માલિની સુબ્રમણીયમ્
C) પુનિત ટંડન D) સંજ્યા બારૂ

નાયબ ચિટનીશ - 02/06/2015

35. નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
A) સાહિત્ય B) રાજકારણ C) બાળમજૂરી D) વિજ્ઞાન

નાયબ ચિટનીશ - 05/02/2017

36. વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો?
A) સુનિલ કોઠારી B) મધુસૂદન ઢાંકી
C) ચીમનભાઈ ત્રિવેદી D) ધીરેન્દ્ર મહેતા

GPSC Class - 2 - 16/04/2017

37. પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ/પ્રાઈઝ આપવામાં આવે છે ?
A) બુકર પ્રાઈઝ B) પુલિત્ઝર પ્રાઈઝ
C) સખેરવો પ્રાઈઝ D) સુલીવાર્ન એવોર્ડ

38. દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે?
A) રમતવીર B) કોચ, શિક્ષક
C) અમ્પાયર, અધિનિર્ણાયક D) રમત સંબંધીત સંપાદક

GPSC Class - 2 - 02/04/2017

39. મેરી સ્કોડોવસ્કા ક્યુરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબેલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણવિજ્ઞાનમાં ક્યા વર્ષમાં મળેલ હતું ?
A) ઈ.સ.1905 B) ઈ.સ.1910 C) ઈ.સ.1911 D) ઈ.સ.1915

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

40. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી ક્યું નામ સાચું નથી ?
A) ઉમાશંકર જોશી B) રાજેન્દ્ર શાહ
C) કનૈયાલાલ મુન્શી D) રઘુવીર ચૌધરી

27)A, 28)D, 29)B, 30)B, 31)B, 32)A, 33)D, 34)B, 35)C, 36)A, 37)B, 38)B, 39)C, 40)C.

GPSC Class - 2 - 12/02/2017

41. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ "ગણમાન્ય ભારતવિદ" પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે?
A) જાપાન B) કોરીયા C) તિબેટ D) ચીન

42. ભારતમાં "સિલ્વર એલિફન્ટ એવોર્ડ" કઈ રમત માટે આપવામાં આવે છે?
A) કબડ્ડી B) કુસ્તી
C) ખો-ખો D) સ્કાઉટ અને ગાઈડ

GPSC Class - 2 - 18/03/2017

43. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ?
A) રાજીવકુમાર ગોસ્વામી B) માનવકુમાર ગોસ્વામી
C) હરિકૃષ્ણગીરી ગોસ્વામી D) ઓમકિશોર ગોસ્વામી

44. વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ?
A) સમુદાય નેતૃત્વ માટે
B) માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે
C) બાળમજૂરી સામે લડત ચલાવવા માટે
D) આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર કલાસ - 2 (25/2/2017)

45. મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?
A) પત્રકારિત્વ સાહિત્ય B) આંતરરાષ્ટ્રીય સદ્‌ભાવ
C) સમાજસેવા D) સંગીત અને રમતગમત

GPSC Class - 2 - 5/3/2017

46. વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે?
A) ભાલચંદ્ર નામદે B) ડૉ.રઘુવીર ચૌધરી
C) શંખ ઘોષ (Shankha Ghosh) D) પ્રતિભા રે

47. સૌ પ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ?
A) ઈન્દીરા ગાંધી B) વિજયા લક્ષ્મી પંડિત
C) મધર ટેરેસા D) સરોજની નાયડું

GPSC Class - 2 - 11/12/2016

48. રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો?
A) ગીત સેઠી B) વિશ્વનાથન આનંદ
C) મલ્લેશ્વરી D) લીયેન્ડર પેસ

49. અર્વાચીન 'અસમિયા સાહિત્ય'ની સ્ત્રી લેખિકા તરીકે જેઓને નવાજવામાં આવેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ સને 2000માં મેળવેલ છે તે હસતી કોણ છે ?
A) પુષ્પા મોતિયાની B) રંજના હરીશ
C) સોનલ પંડ્યા D) ડૉ. ઈન્દીરા ગોસ્વામી

50. રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ?
A) સુમતીબેન મોરારજી B) ચંદાબેન શ્રોફ
C) મધર ટેરેસા D) સિસ્ટર નિવેદિતા

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

51. તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટસ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો?
A) ઈ.સ.1998 B) ઈ.સ.1999
C) ઈ.સ.2000 D) ઈ.સ.2001

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

52. પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે?
A) સાહિત્ય અને પત્રકારત્વ B) વિજ્ઞાન
C) ટેકનોલોજી D) ખેતી

53. પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?
A) 'ભાંગ્યાના ભેરુ' B) 'માનવીની ભવાઈ'
C) 'મળેલા જીવ' D) 'વળામણાં'

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

54. 1971 ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ?
A) ઈન્દિરા ગાંધી B) માણેકશા C) મધર ટેરેસા D) કામરાજ

55. વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
A) ફાળકે એવોર્ડ B) આર્યભટ્ટ એવોર્ડ
C) જ્ઞાનપીઠ એવોર્ડ D) ધન્વંતરી એવોર્ડ

41)D, 42)D, 43)C, 44)B, 45)D, 46)C, 47)C, 48)B, 49)D, 50)C, 51)C, 52)A, 53)B, 54)A, 55)B.

56. તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

A) કનૈયાલાલ ભટ્ટ B) ગુણવંત શાહ
C) ચીનુ મોદી D) રઘુવીર ચૌધરી

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

57. જાન્યુઆરી - 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોને પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ....મહિલાઓ છે. તથા ગુજરાતના.......મહાનુભાવો છે.

A) 19, 7 B) 22, 6 C) 19, 6 D) 21, 6

વિસ્તણ અધિકારી - 7/1/2017

58. નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?

A) લતા મંગેશકર B) ર્ડા.સી.એન.આર.રાવ
C) અટલ બિહારી વાજપેયી D) કપિલદેવ

PSI/ASI ગુજરાતી - 2/5/2015

59. નીચેનામાંથી ક્યા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે?

A) સમાજસેવા B) સાહિત્ય
C) આરોગ્ય સેવા D) વિજ્ઞાન

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

60. સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ મરણોત્તર 'ભારત રત્ન' એવોર્ડ ક્યા મહાનુભાવને આપવામાં આવ્યો ? - લાલ બહાદુર શાસ્રી

પોલીસ કોન્સ્ટેબલ - 2012

61. દાદા સાહેબ ફાળકે એવોર્ડ ક્યા ક્ષેત્રમાં આપવામાં આવે છે? - ફિલ્મ

પ્રોબેશન ઓફિસર - 2016

62. આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક ક્યા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? - 1995

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

63. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ? - નમન પારેખ

64. ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર ક્યો છે ? - ભારત રત્ન

65. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? - આશાપૂર્ણા દેવી

66. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ ક્યા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? - નિશિથ

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

67. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેઈ દેશની કેટલામી ગણમાન્ય વ્યક્તિ છે ? - 44 મી

68. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી ક્યો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? - ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

નાયબ મામલતદાર/DY.S.o - 2012

69. ઠુમરીના પ્રસિધ્ધ ભારતીય કલાકારો એટલે - સિધ્ધેશ્વરી દેવી અને ગિરીજા દેવી

70. દ્રોણાચાર્ય એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય ખેલાડી કોણ ? - ગોપીચંદ

નાયબ મામલતદાર/DY.S.o - 2015

71. બિલીયર્ડની રમત માટે પહેલો અર્જુન એવોર્ડ ક્યા ખેલાડીને આપવામાં આવ્યો હતો ? - વિલ્સન જોન્સ

72. ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી............ છે. - સચિન તેંડુલકર

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

73. પાકિસ્તાન સરકારનો 'નિશાને- પાકિસ્તાન' એવોર્ડ ક્યા ગુજરાતીને આપવામાં આવેલો છે ?- મોરારજી દેસાઈ

સબ ઓડિટર - 2015

74. આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક ક્યા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? - 1995

75. અર્થશાસ્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ? - આમર્ત્ય સેન

સબરજિસ્ટ્રાર - 2013

76. મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા ? - ઈલાબેન ભટ્ટ

77. ગુજરાત સરકાર દ્વારા 'એકલવ્ય એવોર્ડ' કોને અપાય છે ? - ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે

56)D, 57)C, 58)D, 59)B.

TAT - 2012

78. ભારતમાં સર્વોચ્ચ દરજ્જાની રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવતુ સર્વોચ્ચ મુલકી સન્માન ક્યું છે? - **ભારત રત્ન પુરસ્કાર**

PSI નશાબંધી - 2011

79. એવીએસએમ (AVSM)નું પૂર્ણ સ્વરૂપ શું છે ? - **અતિ વિશિષ્ટ સેના મેડલ**

એકાઉન્ટ ઓફિસર - 1999

80. ફિલ્મ ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ક્યો છે ? - **દાદાસાહેબ ફાળકે**
81. પત્રકારત્વનો સર્વોચ્ચ પુરસ્કાર ક્યો છે ? - **પુલિત્ઝર**

ચીફ ઓફિસર - 1999

82. અમર્ત્ય સેનનને ક્યા ક્ષેત્રમાં યોગદાન બદલ નોબેલ પારિતોષિક મળેલું છે ? - **અર્થશાસ્ત્ર**

આયુર્વેદિક ડોક્ટર - 2000

83. ધન્વંતરી પુરસ્કાર ક્યા ક્ષેત્રે અપાય ? - **આરોગ્ય (તબીબી)**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

84. પુલિત્ઝર પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં અપાય છે ? : **પત્રકારત્વ**
85. પ્રસિદ્ધ ભટનાગર પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં અપાય છે? : **વિજ્ઞાન**
86. ધન્વંતરી એવોર્ડ ક્યા ક્ષેત્રના પ્રદાન માટે અપાય છે ? : **તબીબી**
87. જમનાલાલ બજાજ એવોર્ડ ક્યા ક્ષેત્રની સિદ્ધિ માટે છે ? : **સમાજસેવા**
88. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે? : **આશાપુર્ણાદેવી**
89. મેન બુકર પુરસ્કાર ક્યો દેશ આપે છે? : **યુનાઈટેડ કિંગડમ**
90. ટેમ્પલ્ટન પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં અપાય છે? : **ધાર્મિક બાબતો**
91. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને ક્યો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? - **મહાત્મા ગાંધી એવોર્ડ**
92. ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? - **વખાર**
93. ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌપ્રથમ ક્યા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? - **ઝવેરચંદ મેઘાણી**
94. સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? - **કે.કે.બિરલા ફાઉન્ડેશન**
95. વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને ક્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? - **પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ**
96. ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ આપો.- **ઈલાબેન ભટ્ટ**
97. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને ક્યો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?- **મહાત્મા ફુલેં શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ**
98. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે 'નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ? - **વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને**
99. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? - **રૂ.3,50,000**
100. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' ક્યા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? - **1961**
101. ક્યા ગુજરાતી કવિને કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયોહતો ? - **ઉમાશંકર જોષી**
102. ગુજરાતના ક્યા કવિને તેમના ક્યા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવશે ? - **એચ.ડી.કુમારસ્વામી**
103. સાહિત્ય ક્ષેત્રે અપાતી 'જ્ઞાનપીઠ એવોર્ડ' ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? - **સાહુ જૈન પરિવાર**
104. ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ક્યા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? - **ઈ.સ.1999થી**
105. ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? - **પદ્મશ્રી**
106. ક્યા ગુજરાતી કવિને 2016માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ? - **રઘુવીર ચૌધરી**
107. નવલકથાકાર ધીરુબહેન પટેલને કઈ નવલકથા માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? - **આગંતુક**
108. કઈ સંસ્થાને ત્રણવાર શાંતિ માટેનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નોબેલ પ્રાઈઝ મળ્યું ? - **આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિ**
109. ICAN કે જેને નોબેલ પારિતોષિકની જાહેરાત થયેલ છે તેને શું છે ? - **પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે કામ કરતી સંસ્થા**
110. કવિ ઉમાશંકર જોશીને ક્યા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? - **નિશીથ**
111. ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ ક્યા નામથી એનાયત કરવામાં આવે છે ? - **રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ**
112. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરને આપવામાં આવતો અર્જુન એવોર્ડ ક્યા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? - **1961**
113. મહાન લેખક અને નવલકથાકાર કવિ રવીન્દ્રનાથ ટાગોરને ક્યા વર્ષમાં નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા ? : **1913**

મહત્વના દિવસ

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યા કારણસર ઉજવવામાં આવે છે ?
   A) મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન
   B) મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
   C) મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
   D) આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત
2. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

A) World Tuberculosis Day	**1.5 September**
B) Anti Terrorism Day	**2.30 January**
C) Teachers' Day	**3.24 March**
D) World Leprosy Eradication Day	**4.21 May**

   A) D-4, A-3, C-2, B-1 B) C-2, D-1, A-3, B-4
   C) B-1, C-41 A-2, D-3 D) A-3, B-4, D-2, C-1

રેવન્યૂ તલાટી - 28/02/2016

3. ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્યપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે?
   A) 14 ફેબ્રુઆરી B) 22 ડિસેમ્બર
   C) 28 એપ્રિલ D) 27 માર્ચ
4. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) National Science Day	**1) 14 December**
b) World Environment Day	**2) 5 June**
c) National Energy Conservation Day	**3) 14 November**
d) World diabetes Day	**4) 28 February**

   A) c-3, a-4, d-2, b-1 B) a-3, d-1, b-2, c-4
   C) d-1, b-3, a-4, c-2 D) b-2, a-4, c-1, d-3

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

5. 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિન' ક્યારે ઊજવવામાં આવે છે ?
   A) 21 ફેબ્રુઆરી B) 28 જુલાઈ
   C) 11 મે D) 28 ફેબ્રુઆરી

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

6. યુનો તરફથી ક્યા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ?
   A) 21 જૂન B) 24 જૂન C) 1 મે D) 11 મે

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

7. ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ?
   A) 30 જાન્યુઆરી B) 1 મે C) 31 માર્ચ D) 1 માર્ચ

GPSC પ્રિલિમ - 2014

8. પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ?
   A) 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ
   B) 22 માર્ચ - વિશ્વ જળ દિવસ
   C) 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ
   D) 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ
9. આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
   A) વિશ્વ ક્ષય દિન - 24મી માર્ચ
   B) વિશ્વ એઈડ્સ દિવસ - 31મી ડિસેમ્બર
   C) વિશ્વ આરોગ્ય દિન - 7મી એપ્રિલ
   D) તમાકુ વિરોધી દિન - 31મી મે
10. 'રાષ્ટ્રીય રમત દિન'ની ઊજવણી ક્યારે કરવામાં આવે છે ?
   A) 24 ફેબ્રુઆરી B) 24મી નવેમ્બર
   C) 29મી ઓગસ્ટ D) 23મી જૂન

PSI ખાતાકીય - 23/04/2017

11. રાષ્ટ્રીય સુરક્ષા દિન-2017 ક્યારે ઉજવવામાં આવ્યો ?
   A) 25 જાન્યુઆરી B) 7 ફેબ્રુઆરી
   C) 4 માર્ચ D) 21 ઓક્ટોબર
12. ભારતભરમાં 'પોલીસ દિન' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
   A) 26 જાન્યુઆરી B) 21 ઓક્ટોબર
   C) 23 માર્ચ D) 13 નવેમ્બર

1)C, 2)D, 3)D, 4)D, 5)D, 6)A, 7)B, 8)C, 9)B, 10)C, 11)C, 12)B.

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

13. રાષ્ટ્રીય શિક્ષણદિન કઈ તારીખે ઉજવવામાં આવે છે?
   A) 5 સપ્ટેમ્બર B) 11 નવેમ્બર
   C) 2 ઓક્ટોબર D) 30 જાન્યુઆરી
14. વનોના સંરક્ષણ-સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે?
   A) 2010 B) 2011 C) 2012 D) 2013
15. 'વિશ્વ ઓઝોન દિવસ' દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
   A) 16 ઓગષ્ટ B) 21 માર્ચ
   C) 16 સપ્ટેમ્બર D) 16 ઓક્ટોબર

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

16. સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે?
   A) લાલબહાદુર શાસ્ત્રી B) બાબાસાહેબ આંબેડકર
   C) કે કામરાજ D) મોરારજી દેસાઈ

GPSC Class - 2 - 18/12/2016

17. તાજેતરમાં ક્યા માસમાં 'કોમી એકતા સપ્તાહ' મનાવવામાં આવ્યો?
   A) ડીસેમ્બર B) ઓક્ટોબર C) નવેમ્બર D) જાન્યુઆરી

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

18. ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યકિતના માનમાં મનાવવામાં આવે છે?
   A) માઈકલ ટેમર B) સાઈરસ મિસ્ત્રી
   C) ડૉ.અબ્દુલ કલામ D) ડૉ.માગરિટ ચાન
19. સંયુકત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે?
   A) ફેબ્રુઆરી, 21 B) ઓગષ્ટ, 21
   C) જાન્યુઆરી, 21 D) જૂન, 21
20. રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) ક્યારે મનાવવામાં આવે છે?
   A) ડિસેમ્બર, 1 B) ડિસેમ્બર, 3
   C) નવેમ્બર, 30 D) ડિસેમ્બર, 2

GPSC Class - 2 - 28/1/2017

21. દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
   A) વિશ્વ વન દિવસ B) વિશ્વ હેરીટેઝ દિવસ
   C) વિશ્વ જન સંખ્યા દિવસ D) ઊર્જા સંરક્ષણ દિવસ

GPSC Class-1 - 15/01/2017

22. ભારતમાં "Good Governance Day" ક્યારે મનાવવામાં આવે છે?
   A) 23 ડિસેમ્બર B) 24 ડિસેમ્બર
   C) 26 ડિસેમ્બર D) 25 ડિસેમ્બર

GPSC Class-1 - 15/01/2017

23. રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે ?
   A) 20 નવેમ્બર B) 22 નવેમ્બર
   C) 25 નવેમ્બર D) 26 નવેમ્બર
24. મહિલા અત્યારચાર વિરોધ દિન ક્યા વર્ષથી મનાવવામાં આવે છે?
   A) 1998 B) 1999 C) 2000 D) 2001

GPSC Class-1 - 15/01/2017

25. ....દિવસ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે.
   A) 10મી એપ્રિલ B) 7મી માર્ચ
   C) 7મી એપ્રિલ D) 7મી જૂન
26. ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાય છે?
   A) પ્રતિ વર્ષ 1 થી 7 સપ્ટેમ્બર B) પ્રતિ વર્ષ 1 થી 7 ઓગષ્ટ
   C) પ્રતિ વર્ષ 1 થી 7 નવેમ્બર D) પ્રતિ વર્ષ 1 થી 7 ઓક્ટોબર
27. મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાય છે?
   A) સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ)
   B) મધ્યાહ્ન ભોજન યોજના
   C) રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના
   D) અંધત્વ નિવારણ કાર્યક્રમ
28. અન્નપ્રાશન દિવસ આંગણવાડીમાં ક્યારે ઉજવાય છે?
   A) દર બુધવારે B) દર મહિનાના શુક્રવારે
   C) દર સોમવારે D) ઉપરોક્તમાંથી કોઈ નહી

GPSC Class - 2 - 16/04/2017

29. વિશ્વ મહિલા દિવસ "International Woman's Day" ક્યારે ઉજવાય છે?
   A) 6 માર્ચ B) 7 માર્ચ C) 8 માર્ચ D) 9 માર્ચ

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

30. 'વિશ્વ માતૃભાષા દિવસ' ક્યારે ઊજવાય છે ?
   A) 20 ફેબ્રુઆરી B) 21 ફેબ્રુઆરી
   C) 23 ફેબ્રુઆરી D) 24 ફેબ્રુઆરી

13)B, 14)B, 15)C, 16)B, 17)C, 18)C, 19)D, 20)D, 21)C, 22)D, 23)D, 24)B, 25)C, 26)A, 27)A, 28)B, 29)C, 30)B.

31. તારીખ અને તેના સંબંધમાં ઉજવાતા દિવસના જોડકામાંથી ક્યું જોડકું સાચું છે ?
1) 21 માર્ચ : વિશ્વ જલસ્રોત દિવસ
2) 18 એપ્રિલ : વિશ્વ વન દિવસ
3) 3 મે : વિશ્વ પૃથ્વી દિવસ
4) 14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ
A) 1 B) 2 C) 3 D) 4

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

32. "ગુડ ગવર્નન્સ ડે" કોના જન્મદિવસે મનાવવામાં આવે છે?
A) એ પી જે અબ્દુલ કલામ B) અટલ બિહારી વાજપાઈ
C) લાલ બહાદુર શાસ્ત્રી D) વિનોબા ભાવે

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

33. નીચેના જોડકાં યોગ્યો રીતે જોડો સાચો વિકલ્પ પસંદ કરો.

વર્ષ	સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અનુસાર
a) 2014	i) વિકાસ માટે ટકાઉ પ્રવાસનનું આંતર રાષ્ટ્રીય વર્ષ
b) 2015	ii) પ્રકાશ અને પ્રકાશ આધારિત ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ
c) 2016	iii) કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ
d) 2017	iv) કુટુંબ ખેતીનું આંતરરાષ્ટ્રીય વર્ષ

A) a - iv, b - ii, c - iii, d - i B) a - i, b - ii, c - iii, d - iv
C) a - ii, b - i, c - iii, d - iv D) a - iii, b - ii, c - i, d - iv

34. સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને ક્યા દાયકાં તરીકે જાહેર કરવામાં આવ્યું છે?
A) સૌના માટે ટકાઉ (sustainable) ઉર્જાનો દાયકો
B) ટકાઉ (sustainable) વિકાસ માટે શિક્ષણનો દાયકો
C) કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો
D) માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો

GPSC Class - 1 - 28/01/2017

35. વિશ્વ પૃથ્વી દિવસ પ્રતિવર્ષ ક્યા દિવસે મનાવવામાં આવે છે?
A) 16 સપ્ટેમ્બર B) 21 માર્ચ
C) 5 જૂન D) 22 એપ્રિલ

નાયબ ચિટનીશ - 02/06/2015

36. ગુજરાત સરકારે ક્યા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ?
A) 2006 B) 2011 C) 2007 D) 2008

નાયબ ચિટનીશ - 05/02/2017

37. 'રાષ્ટ્રીય ટૅકનોલોજી દિન' ક્યા દિવસે મનાવવામાં આવે છે ?
A) 11th September B) 11th May
C) 12th January D) 9th May

GPSC Class - 2 - 16/04/2017

38. વિશ્વ જૈવ વિવિધતા દિવસ (International day for biological Diversity or World Biodiversity day) ક્યારે ઉજવાય છે?
A) 16મી સપ્ટેમ્બર B) 29મી ડીસેમ્બર
C) 15મી જૂન D) 22મી એપ્રીલ

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર કલાસ - 2 (25/2/2017)

39. 21 ફેબ્રુઆરીનો દિવસ ક્યા દિન તરીકે ઉજવાય છે ?
A) માતૃભાષા દિન B) આંતરરાષ્ટ્રીય મહિલા દિન
C) ગુજરાતી વ્યાકરણ દિન D) મજૂર દિન

40. માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ?
A) 10મી ડિસેમ્બર B) 8મી માર્ચ
C) 15મી જૂ D) 12મી ઓક્ટોબર

41. મહિલા અત્યાચાર વિરોધ દિન ક્યા વર્ષથી મનાવવામાં આવે છે?
A) 1998 B) 1999 C) 2000 D) 2001

42. કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
A) યુનિસેફ B) યુનેસ્કો
C) યુનાઈટેડ નેશન્સ (યુ.એન.) D) વર્લ્ડ બેંક

43. રાષ્ટ્ર બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
A) 24મી જાન્યુઆરી B) 25મી જાન્યુઆરી
C) 26મી જાન્યુઆરી D) 30મી જાન્યુઆરી

44. મૂળ નિવાસી (આદિવાસી) દિવસ કઈ તારીખે ઉજવાય છે ?
A) 9મી ઓગસ્ટ B) 15મી નવેમ્બર
C) 14મી જાન્યુઆરી D) 2જી ઓક્ટોબર

GPSC Class - 2 - 5/3/2017

45. દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?
A) વિજય દિવસ B) વિજળી બચાવો દિવસ
C) કિસાન દિવસ D) ગ્રાહક દિવસ

31)D, 32)B, 33)A, 34)A, 35)D, 36)C, 37)B, 38)B, 39)A, 40)A, 41)B, 42)C, 43)A, 44)A, 45)A.

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

46. ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ક્યા દિવસે ઉજવાય છે ?
A) 28 ઓગસ્ટ B) 28 માર્ચ
C) 28 જૂન D) 28 ફેબ્રુઆરી

47. યુનાઈટેડ નેશન્સે ક્યા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું?
A) 2002 B) 1990 C) 2001 D) 1975

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

48. વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ?
A) 2 થી 9 માર્ચ B) 1 થી 7 જૂન
C) 2 થી 9 ઓક્ટોબર D) એકેય નહીં

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

49. 14 મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ?
A) હિન્દી દિન B) બાલ દિન
C) વિશ્વ વિકલાંગ દિન D) માનવ અધિકાર દિન

GSSSB મિકેનિક - 2017

50. વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી ક્યા દિવસે થાય છે ?
A) 26 જાન્યુઆરી B) 5 જૂન
C) 31 જુલાઈ D) 15 ઓગસ્ટ

GSSSB સર્વેયર - 2016-17

51. આપણા દેશમાં 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી છે ?
A) 2006 B) 2001 C) 2004 D) 2003

મુખ્ય સેવિકા - 8/1/2017

52. આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
A) દર શનિવારે
B) દર મંગળવારે
C) મહિનાના ચોથા શુક્રવારે
D) મહિનાના બીજા મંગળવારે

વિસ્તરણ અધિકારી - 7/1/2017

53. અખિલ ભારત સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ?
A) 5 મી જાન્યુઆરી B) 5 મી સપ્ટેમ્બર
C) 14 મી નવેમ્બર D) 25 મી ડિસેમ્બર

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

54. વ્યક્તિની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે.આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?
A) 12 મી જુન B) 22 સપ્ટેમ્બર
C) 19 સપ્ટેમ્બર D) 21 મી જુન

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

55. પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અંત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્ત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે' ક્યા દિવસે મનાવવામાં આવે છે ?
A) 18મી ઓક્ટોબર B) 15 મી મે
C) 18મી એપ્રિલ D) 17મી માર્ચ

56. માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમીઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે' ક્યા દિવસે મનાવવામાં આવે છે?
A) 18, જુન B) 8, મે C) 8, માર્ચ D) 18, એપ્રિલ

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

57. ફેબ્રુઆરી માસના ક્યા દિવસને 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' તરીકે મનાવાય છે ? - **24મી ફેબ્રુઆરી**

ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

58. "વિશ્વ યોગ દિવસ" ક્યો છે ? - **21 જૂન**
59. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે ? - **5મી જૂન**

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

60. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? - **28 ફેબ્રુઆરી**

46)D, 47)D, 48)C, 49)B, 50)B, 51)D, 52)C, 53)C, 54)D, 55)C, 56)B.

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

61. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે મનાવાય છે ? - 5 જૂન
62. ક્યો દિવસ 'આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પ્રતિરોધક દિન' તરીકે ઉજવાય છે ? - 26 જૂન

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

63. વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? - માનવ અધિકાર દિવસ

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

64. યુ.એન.દિવસ (United Nations Day) તરીકે ક્યો દિવસ ઉજવવામાં આવે છે ? 24 ઓક્ટોબર
65. 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' કઈ તારીખે ઉજવાય છે ? - 24 ડિસેમ્બર
66. વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે ક્યા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? - 5મી જૂન
67. કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઊજવાય છે ? - ડૉ.રાધાકૃષ્ણન
68. દર વર્ષે 16 સપ્ટેમ્બરને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? - ઓઝોન

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

69. વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? - 16 મી સપ્ટેમ્બર

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર ક્લાર્ક - 2012

70. 'વિશ્વ ટેલિકોમ્યુનિકેશન ડે' કઈ તારીખે ઉજવાય છે ? - 17 મે
71. ગુજરાતના કયા પક્ષીવિદ્ને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા ? - સલીમ અલી
72. રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય છે? - 29ઓગસ્ટ
73. 'સ્વૈચ્છિક રક્તદાન દિન' કઈ તારીખે મનાવવામાં આવે છે ? - 1 ઓક્ટોબર

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

74. સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે ? - કસ્તુરબા ગાંધી

નાયબ મામલતદાર/DY.S.o - 2015

75. મે માસનો કયો દિવસ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' તરીકે ઉજવવામાં આવે છે ? - 31 મે

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

76. માર્ચ માસની કઈ તારીખે 'વિશ્વ ગ્રાહક દિન' મનાવાય છે ? - 15મી માર્ચ

સબરજિસ્ટ્રાર - 2013

77. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દર વર્ષે ક્યા દિવસે થાય છે ? - 8 માર્ચ

PSI નશાબંધી - 2011

78. 8મી મેને ક્યા દિવસ તરીકે મનાવવામાં આવે છે ? - વિશ્વ રેડક્રોસ દિન

આંકડાકીય અધિકારી - 2000

79. ક્યા વર્ષથી 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવાય છે ? - 1950

ચીફ ઓફિસર - 1999

80. બાળ દિન તરીકે કોનો જન્મ દિવસ ઉજવાય છે ? - જવાહરલાલ નેહરુ
81. ક્યા દિવસે શિક્ષક દિનની ઉજવણી થાય છે ? - 5 સપ્ટેમ્બર
82. બાંગ્લાદેશનો વિજયદિન ઉજવાય છે ? - 16 ડિસેમ્બર
83. 1 ડિસેમ્બરનીક્યા દિવસ તરીકે ઉજવણી થાયછે ? - એઈડ્ઝ દિવસ
84. 12 જાન્યુઆરી ક્યા મહાનુભાવનો જન્મ દિન છે ? - સ્વામી વિવેકાનંદ

આયુર્વેદિક ડૉક્ટર - 2000

85. હિન્દી દિવસક્યારે મનાવાય છે ? - 14 સપ્ટેમ્બર
86. વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે મનાવાય છે ? - 1 ડિસેમ્બર

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

87. માનવ અધિકાર દિવસ ક્યારે મનાવાય ? : 10 ડિસેમ્બર
88. 31 મે એ ક્યો દિવસ મનાવાય ? : એન્ટિ ટોબેકો ડે
89. વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવાય ? : મે મહિનાનો પહેલો રવિવાર (પ્રથમ વખત 10 ડિસેમ્બરે)
90. વિશ્વભરમાં 22મી એપ્રિલ ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? - અર્થ ડે
91. આપણા દેશમાં 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? - 2003
92. ક્યો દિવસ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્તિ દિવસ તરીકે અમલમાં છે ? - 3 જૂન

93. કેન્સરના રોગને નાબૂદ કરવા અને તમાકુના વ્યસનથી નાગરિકોને છૂટકારો અપાવવાના હેતુસર 'નો ટોબેકો ડે' વર્ષના ક્યા દિવસે મનાવવામાં આવે છે ? - **31મી મે**

94. વિશ્વભરમાં ક્યા દિવસને વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે ? - **11 જુલાઈ**

95. વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે........ના દિવસે ઉજવવામાં આવે છે. - **7, એપ્રિલ**

96. વ્યક્તિની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? - **21મી જૂન**

97. 7મી એપ્રિલને વિશ્વભરમાં ક્યા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ? - વર્લ્ડ હેલ્થ ડે

98. ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ' દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? - **14મી નવેમ્બર**

99. ગરીબીએ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબૂદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? - **17 ઓક્ટોબર**

100. વિશ્વમાં 'વર્લ્ડ પોસ્ટ ડે' કઈ તારીખે મનાવવામાં આવે છે ? - **9 ઓક્ટોબર**

101. 'વિશ્વ પૃથ્વી દિવસ' ક્યો ? - **22 એપ્રિલ**

102. વિશ્વ ઓટિઝમ જાગૃકતા દિવસ ક્યારે મનાવાય છે ? - **2 એપ્રિલ**

103. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? - **3 માર્ચ**

104. વિશ્વ પર્યાવરણ દિન ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? - **5 જૂન**

105. વર્લ્ડ એનિમલ ડે ક્યા દિવસે મનાવવામાં આવે છે ? - **4 ઓક્ટોબર**

106. 22 એપ્રિલ ક્યા દિવસ તરીકે મનાવાય છે ? - **વિશ્વ પૃથ્વી દિવસ**

107. દર વર્ષે વિશ્વ બાળ દિવસ...........રોજ મનાવવામાં આવે છે. - **20 નવેમ્બર**

108. ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? - **29 ઓગસ્ટ**

109. ભારત સરકાર દ્વારા ક્યા દિવસને **'સિવિલ સેવા દિવસ'** તરીકે ઉજવવામાં આવે છે ? - **21મી એપ્રિલ**

110. ભારતમાં એન્જિનિયર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? - **15 સપ્ટેમ્બર**

111. ભારતનો બંધારણ દિવસ ક્યારે ક્યા દિવસે મનાવવામાં આવે છે ? - **26 નવેમ્બર**

112. 7મી એપ્રિલને વિશ્વભરમાં ક્યા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ? - **વર્લ્ડ હેલ્થ ડે**

113. ડાયાબીટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? - **14મી નવેમ્બર**

114. 'વિશ્વ કામદાર દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? - **1 મે**

115. વિશ્વભરમાં પ્રતિવર્ષ 5મી જૂનનો દિવસ ક્યા હેતુસર ઉજવવામાં આવે છે? : **વિશ્વ પર્યાવરણ દિવસ**

116. પ્રતિવર્ષ 'વિશ્વ જળ દિન' ઉજવવામાં આવે છે. : **22મી માર્ચ**

117. 'વિશ્વ મેલેરિયા દિન' ક્યારે મનાવવામાં આવે છે ? : **25 એપ્રિલ**

118. ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day) ક્યારે ઉજવવામાં આવે છે ? : **1 જુલાઈ**

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ (મહાનુભાવો)

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

1. ડૉ. અબ્દુલ કલામનો જન્મ ક્યા થયો હતો ?
A)ચેન્નાઈ B)રામેશ્વરમ્ C)કન્યાકુમારી D)પોંડીચેરી

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

2. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?
A)મારા અનુભવો B) કાર્ડિયોગ્રામ
C)મુસાફિર D)અગન પંખ

3. ડૉ.બાબાસાહેબ આંબેડકર તેમના ક્યા કાર્ય માટે વધુ જાણીતા છે?
A)અસ્પૃશ્યતા નિવારણ B) બૌદ્ધ ધર્મના પ્રચાર
C)બંધારણના ઘડવૈયા D)હિન્દુ મુસ્લિમ એક્તા

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

4. આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?
A)રવિશંકર મહારાજ B) ઠક્કરબાપા
C)જુગતરામ D)નાનાભાઈ ભટ્ટ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

5. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ?
A)રાકેશ શર્મા B) સતિશ શર્મા
C)કલ્પના ચાવલા D)વિક્રમ સારાભાઈ

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

6. ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?
A)વલ્લભભાઈ પટેલ B) ઝવેરચંદ મેઘાણી
C)ચંદ્રકાન્ત મહેતા D) કલાપી

GPSC પેપર - 1 - 2017

7. 'ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યૂશન' ("The Problem of the Rupee : Its origin and its Solutions") નામનું પુસ્તક કોણે લખ્યું ?
A)ડૉ.બી.આર. આંબેડકર B) એમ.કે. ગાંધી
C)રાજગોપાલાચારી ચક્રવર્તી D)આઈ.જી. પટેલ

8. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?
A)વિવેકાનંદ B)દયાનંદ સરસ્વતી
C)બી.આર. આંબેડકર D)મહાત્મા હંસરાજ

9. નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ".
A)મહાત્મા ગાંધી B)જવાહરલાલ નેહરુ
C)આંબેડકર D)ઈન્દિરા ગાંધી

10. "મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો?
A)હિરાલ્ડ લાસવેલ B)યેઝેકેલ ડ્રોર
C)ચાર્લ્સ લિંડબ્લોમ D)ક્રિસ્ટોફર કોલીટ

GPSC MAINS પેપર - 1 - 2016

11. ગુજરાતના ક્યા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ?
A)બળવંતરાય મહેતા B)ઈન્દુલાલ યાજ્ઞિક
C)સરદાર વલ્લભભાઈ પટેલ D)મોરારજી દેસાઈ

PSI GK - 1/1/2017

12. નીચેનામાંથી ક્યું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી ?
A)Inspiring Thoughts B)The Indian Space Journey
C) Wings of fire D)Ignited Minds

GPSC પ્રિલિમ - 2001

13. ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?
A)ડૉ.સ્વામીનાથન B)ડૉ.મનમોહનસિંહ
C)ડૉ.કુરિયન D)ડૉ.હોમીભાભા

14. નાટયલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર - એવી વ્યક્તિ કઈ ?
A)પદમજા નાયડુ B)નરસિંહરાવ
C)રાજગોપાલાચારી D)કનૈયાલાલ મુનશી

15. ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ?
A)દિગંત મહેતા B)દિગંત ઓઝા
C)પિત્રોડા D)દેવાંગ મહેતા

1)B, 2)D, 3)C, 4)C, 5)A, 6)B, 7)A, 8)A, 9)B, 10)B, 11)A, 12)B, 13)C, 14)D, 15)D.

16. "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?
A)અમૃતાનંદમીય દેવી B)અનંતાનંદતીર્થ
C)રજનીશ D)શ્રી શ્રી રવિશંકર

GPSC પ્રિલિમ - 2014

17. 'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળિયામણું વૃક્ષ - 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.
A)રવીન્દ્રનાથ ટાગોર B) પંડિત મદનમોહન માલવીય
C)મહાત્મા ગાંધી D)ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

18. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુરશાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
A)શાસ્ત્રીઘાટ B)રાજઘાટ C)વિજયઘાટ D)લાલઘાટ

PSI/ASI GK - 2/5/2015

19. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?
A)ડૉ.એ.આર.પાઠક B) હર્ષદ શાહ
C)ડૉ.અક્ષય અગ્રવાલ D)પંકજ જાની

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

20. મહાનુભાવોનું નામ અને જુદુંનામ (Sobriquet) યોગ્ય રીતે જોડો.
1) અબ્દુલ ગફારખાન A) શાંતિદુત
2) બાળ ગંગાધર ટીળક B) દેશબંધુ
3) સી.આર.દાસ C) લોકમાન્ય
4) લાલ બહાદુર શાસ્ત્રી D)સરહદના ગાંધી
A) 1-A, 2-D, 3-C, 4-B B) 1-B, 2-A, 3-D, 4-C
C) 1-C, 2-B, 3-A, 4-D D) 1-D, 2-C, 3-B, 4-A

GPSC Class - 2 - 18/12/2016

21. 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે?
A)રવિન્દ્રનાથ ટાગોર B) અવનિન્દ્રનાથ ટાગોર
C)અરવિંદ ઘોષ D)માનવેન્દ્રનાથ ટાગોર

22. નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા?
A)મોહનલાલ પંડયા B) મથુરદાદા
C)વિનાયકપ્રસાદ D)ચંદુલાલ દેસાઈ

GPSC Class-1 - 15/01/2017

23. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના ક્યા શહેરમાં સર્વપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?
A)ગોધરા B)દાહોદ C)સંતરામપુર D)ઝાલોદ

24. ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત .... થી થયેલ ગણાય છે ?
A)દુર્ગારામ મહેતાજી B) મહીપતરામ રૂપરામ
C)દલપતરામ D)દયારામ

25. 30 ડિસેમ્બર 1971ની વહેલી સવારે દેશના ક્યા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?
A)વિક્રમ સારાભાઈ B)હોમીભાભા
C)ત્રિભુવન ગજ્જર D)નટવરલાલ પંડ્યા

26. નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ?
A)માર્કસ B)ડૉ.બી.આર. આંબેડકર
C)માલ્થસ D)મેક્સવેબર

27. કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
A)દમયંતી બરડાઈ B) હમિદા મીર
C)મિનલ રાઠોડ D)દિવાળીબેન ભીલ

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

28. કમ્પ્યૂટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ?
A)રામાનુજ B) રાણી પાણીગ્રહી
C)રાજા રમન્ના D)શકુંતલા દેવી

29. મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું ક્યું જોડકું યોગ્ય નથી.
1. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે
2. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે.
3. મનમોહન દેસાઈ - ચલચીત્ર નિર્માતા
4. ફારૂક શેખ : ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે.
A) 1 B) 2 C) 3 D) 4

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

30. "ગાંધની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યુ?
A)અનસુયાબેન પટેલ B) પૂર્ણિમાબેન પકવાસા
C) મણીબેન પટેલ D)રત્નાબેન પલાસ

16)D, 17)C, 18)C, 19)B, 20)D, 21)A, 22)D, 23)B, 24)A, 25)A, 26)B, 27)D, 28)D, 29)D, 30)B.

31. અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝીયમની સ્થાપના કોણે કરી?
A)ગૌતમ સારાભાઈ B) વિક્રમ સારાભાઈ
C) મૃણાલિની સારાભાઈ D) અનસુયાબેન સારાભાઈ

નાયબ ચિટનીશ - 05/02/2017

32. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ?
A)નરેન્દ્ર મોદી B) અટલ બિહારી વાજપેયી
C) એ.પી.જે.અબ્દુલ કલામ D) ઈન્દિરા ગાંધી

33. નીચેનામાંથી કઈ બાબતો ડૉ.ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલ નથી ?
A)પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
B) સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
C) હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર
D)રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

34. "કુમાર" સામાયિકના સ્થાપક-સંપાદક કોણ હતાં ?
A)બચુભાઈ રાવત B) રવિશંકર રાવળ
C) ચાંપશીભાઈ ઉદેશી D) હાજી અલ્લારખાં શિવજી

35. "ગ્રામદાન"નો વિચાર કોણે આપેલો ?
A) ગાંધીજી B) દાદા ધર્માધિકારી
C) જયપ્રકાશ નારાયણ D) વિનોબા ભાવે

GPSC Class - 2 - 12/02/2017

36. ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે?
A)એલેક્ઝાન્ડર કિન્લો ફોર્બ્સ B) ફતેહસિંહ ગાયકવાડ
C) રાવ ખેંગારજી ત્રીજા D)મોતીભાઈ અમીન

37. કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ.ભીમરાવ આંબેડકરની જયંતીને ક્યા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે?
A)રાષ્ટ્રીય ગૌરવ દિવસ B) રાષ્ટ્રીય જલ દિવસ
C) રાષ્ટ્રીય પરિવર્તન દિવસ D) રાષ્ટ્રીય શિક્ષા દિવસ

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

38. મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ?
A)અનસુયાબેન સારાભાઈ B) દિવાળીબેન ભીલ
C) પૂર્ણિમાબેન પકવાસા D) ઈલાબેન ભટ્ટ

39. ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ?
A)હોમાઈ વ્યારાવાલા B) કે.જી.સુબ્રમણ્યમ
C) વનરાજ ભાટિયા D)કુમુદિની લાખિયા

40. ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે?
A)ત્રિભુવનદાસ પટેલ B) ડૉ.વર્ગીસ કુરિયન
C) રામસિંહ પરમાર D)એમ.એમ.પટેલ

41. ક્યા ગુજરાતીને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?
A)મહાત્મા ગાંધીજી B) રવિશંકર મહારાજ
C) જમશેદજી તાતા D)સરદાર વલ્લભભાઈ પટેલ

42. 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ?
A)રઘુરામ રાજન B) વિરલ વી. આચાર્ય
C) ઊર્જિત પટેલ D) બિમલ જલાન

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

43. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?
A) જવાહરલાલ નેહરુ B) મહાત્મા ગાંધી
C) સરદાર વલ્લભભાઈ પટેલ D) દાદાભાઈ નવરોજી

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

44. ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?
A)જયપ્રકાશ નારાયણ B) સરદાર વલ્લભભાઈ પટેલ
C)બબલાભાઈ મહેતા D)વિનોબા ભાવે

45. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ?
A)સુભાષચંદ્ર બોઝ B) સરદાર વલ્લભભાઈ પટેલ
C) ગાંધીજી D) ડૉ.બાબા સાહેબ આંબેડકર

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

46. 'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' લેખક કોણ છે ?
A) અબ્દુલ કલામ B) શેક્સપિયર
C) રિચાર્ડ બચ D) જહોન રસ્કિન

47. 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?
A) લાલ બહાદુર શાસ્ત્રી B) મહાત્મા ગાંધી
C) જવાહરલાલ નહેરુ D) બાલ ગંગાધર ટિળક

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

48. કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ?
A)અટીરા B)ઈસરો C) પી.આર.એલ. D) સેપ્ટ

31)A, 32)B, 33)D, 34)B, 35)D, 36)D, 37)B, 38)A, 39)A, 40)B, 41)D, 42)B, 43)C, 44)A, 45)D, 46)A, 47)A, , 48)A.

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

49. અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ"નામે સંસ્થાનનું ઉદ્દઘાટન અને નામકરણ કોણે કરેલું છે?
A) મૃદુલાબેન સારાભાઈ B) જ્યોતિબા ફૂલે
C) મહારાણી ચીમનભાઈ પહેલા D) મહાત્મા ગાંધી

મુખ્ય સેવિકા - 8/1/2017

50. ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?
A) ગાંધીજી B) વિક્રમ સારાભાઈ
C) સરદાર વલ્લભભાઈ પટેલ D) જવાહરલાલ નહેરુ

વિસ્તણ અધિકારી - 7/1/2017

51. સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ?
A) શ્રી બાબુભાઈ પટેલ B) શ્રી માધવલાલ શાહ
C) ડૉ.જ્યંતિભાઈ પટેલ D) શ્રી ગોપાળદાસ ર.પટેલ

52. IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
A) પંડિત જવાહરલાલ નહેરુ B) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
C) ડૉ.વિક્રમ સારાભાઈ D) અટલ બિહારી વાજપેયી

53. "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ?
A) ડૉ.વી.કુરિયન B) શ્રી રામસિંહ પરમાર
C) શ્રી ત્રિભોવનદાસ પટેલ D) શ્રી મોતીભાઈ ચૌધરી

54. "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો."- આ કથન કોણે કરેલું ?
A) સુભાષચંદ્ર બોઝ B) ડૉ.આંબેડકર
C) જવાહરલાલ નેહરુ D) ગોપાલકિશ્ન ગોખલે

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

55. ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું?
A) સવાયા સર્જક B) સવાઈ ગુજરાતી
C) લલિત નિબંધકાર D) મરાઠી સર્જક

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

56. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?
A) પન્ના નાયક B) સ્વામી આનંદ
C) દામોદર બોટાદકર D) કાકા કાલેલકર

57. ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમ્યાન કયા રાજયના ગર્વનર તરીકે નિમવામાં આવ્યાં હતા?
A) કર્ણાટક B) આંધ્ર C) ઓરિસ્સા D) તામિલનાડુ

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

58. 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' - આ વિધાન............નું છે.
A) ચાણક્ય B) સરદાર પટેલ
C) ગાંધીજી D) બાબાસાહેબ આંબેડકર

59. નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?
A) માઈકલ જુસીયસ B) ફ્રેડરિક ટેલર
C) ફ્રેડરિક હઝબર્ગ D) આર.સી.ડેવિસ

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 2012

61. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયાં થયો હતો ? - **નડિયાદ**

62. ગુજરાત ઈ-કોમર્સ (ઈ-commerce) નામના બિઝનેસથી માહિતગાર કરનાર તથા ઈન્ફર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં અલગ ઓળખ ધરાવનાર ગુજરાતી બિઝનેસ વુમન કોણ છે ? - **રૂઝાન ખંભાતા**

63. ગુજરાતમાં નર્મદા ડેમ ઉપર સરદાર વલ્લભભાઈની ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવનાર છે. તેને શું નામ આપવામાં આવ્યું છે ? - **સ્ટેચ્યુ ઓફ યુનિટી**

પોલીસ કોન્સ્ટેબલ - 2012

64. સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? - **મો.ક. ગાંધી**

65. મહાત્મા ગાંધી સાથે કયુ સ્થળ સંકળાયેલું છે ? - **સાબરમતી, ચંપારણ, વર્ધા**

66. કયો જવાબ સાચો છે? - **શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજયપાલ,) વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક, રવિશંકર રાવળ : ચિત્રકાર**

67. નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે? - **રવિન્દ્રનાથ ટાગોર : ગીતાંજલિ રચયિતા, સુભાષચંદ્ર બોઝ : આઝાદ હિન્દ ફોઝ, ડો.રાજેન્દ્રપ્રસાદ : ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ**

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

68. 'અભયઘાટ' કયા રાજપુરુષનું સમાધિસ્થળ છે ? - **મોરારજી દેસાઈ**

49)D, 50)B, 51)D, 52)C, 53)C, 54)C, 55)B, 56)D, 57)C, 58)C, 59)C.

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

69. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા? - **છોટુભાઈ પુરાણી**

પ્રોબેશન ઓફિસર - 2016

70. દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? - **બહિષ્કૃત હિતકારીણી સંસ્થા**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

71. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? - **23-1-1897**
72. ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? - **નાનાભાઈ ભટ્ટ**
73. 'ગુજરાત વિધાનસભા'નું નામ ક્યા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ? - **વિઠ્ઠલભાઈ પટેલ**
74. ક્યા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? - **શ્યામજી કૃષ્ણવર્મા**
75. ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? - **દુલા ભાયા કાગ**
76. ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? - **ભુલાભાઈ દેસાઈ**
77. લક્ષ્મી મિત્તલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? - **લોખંડ**
78. ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? - **સરોજિની નાયડુ**
79. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ? - **ગોપાલકૃષ્ણ ગોખલે**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

80. 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂંક કરવામાં આવી હતી ? - **મણીલાલ**
81. અમૂલડેરીના સ્થાપક કોણ હતા ? - **ત્રિભુવનદાસ પટેલ**
82. ચિત્રકાર, શિલ્પકાર અને સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહિલા કે જેના પિતાજી એક પ્રકૃતિવિદ હતા.. - **એસ્થર ડેવિડ**
83. પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે **નહિ** ઝુકનાર મહિલા.... - **સુચેતા કૃપલાણી**

મહેસૂલી તલાટી - 2014

84. ક્યા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન 'કુમાર'ની શરૂઆત કરી હતી? - **રવિશંકર**

TET- II - ભાષા - 2014

85. ક્યા વિકલાંગે પોતાના કૃત્રિમ પગના સહારે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું ? - **અરૂણિમા સિંહા**

TET- II - ભાષા - 2015

86. સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? - **નાનાભાઈ ભટ્ટ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

87. "આર્થિક સંસ્થામાં આવતા પરિવર્તનો સમાજની અન્ય સંસ્થા પર પ્રભાવક સાબિત થાય છે." એવો મત કોનો છે ? - **કાર્લ માર્કસ**
88. ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે? - **નવસારી**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

89. ભારતીય વૈદકશાસ્ત્રના પ્રણેતાઓ કોણ ગણાય છે ? - **ચરક અને સુશ્રુત**
90. વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધ વાપરવાની શરૂઆત કોના દ્વારા થઈ? - **નાગાર્જુન**

ગુજરાત હાઈકોર્ટ જૂનિયર કલાર્ક - 2012

91. સમુદ્ર તરણ સ્પર્ધામાં નીચેના પૈકી ક્યા ગુજરાતીએ કૌશલ્ય દાખવેલ છે ? - **નાથુરામ પહાડે**
92. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? - **શ્રીમદ્ રાજચંદ્ર**
93. ઠક્કરબાપા દ્વારા કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી ? - **ભીલ સેવા મંડળ**
94. બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે આ ઉક્તિ કોની છે ? - **ટીપુ સુલતાન**
95. 'લોક નાયક' તરીકે નીચેના પૈકી કોણ જાણીતું છે ? - **જયપ્રકાશ નારાયણ**

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

96. અમદાવાદ મહાનગરપાલિકાના સૌ પ્રથમ મેયર કોણ હતાં ? - **ચિનુભાઈ સી. શેઠ**
97. ભારતની સર્વોચ્ચ અદાલતના સૌ પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ હતાં. - **શ્રી હરીલાલ કણિયા**
98. ક્યાં ગુજરાતી મહાનુભાવના આશિર્વાદપૂર્વક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ? - **પૂ. રવિશંકર મહારાજ**

99. ડૉ. બાબાસાહેબ આંબેડકરને કઈ બાબત લાગુ પડતી છે ? - **વડોદરામાં નોકરી, થોટ્સ ઓન પાકિસ્તાન પુસ્તકનું લેખન, ભારતના બંધારણનાં ઘડવૈયા**

100. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતાં? - **શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક**

101. ગુજરાતમાં નિર્માણધીન ક્રાંતિતીર્થ સાથે કોનું નામ જોડાયેલું છે ? - **શ્યામજી કૃષ્ણ વર્મા**

102. ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતાં? - **હંસાબહેન મહેતા**

103. વહાણવટાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મહિલા કોણ છે ? - **સુમતીબહેન મોરારજી**

104. વિકિલિક્સ વેબસાઈટના સ્થાપક અસાંજે કયાં દેશના નાગરિક છે ? - **ઓસ્ટ્રેલિયા**

105. હિંદભરમાં ટેક્ષટાઈલ ઉદ્યોગ શરુ કરવાનો સૌ પ્રથમ વિચાર કરનાર કોણ હતું ? - **કાવસજી દાવર**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

106. શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલાં હતાં ? - **થિયોસોફિકલ સોસાયટી**

107. ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ? - **પ્રિયા ઝિન્ગાન**

108. ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ ? - **લીલા શેઠ**

109. ગુજરાતના સમાજ સુધારકોની પ્રવૃત્તિઓમાં નીચેના પૈકી એક જોડકું સાચું છે? - **દુર્ગારામ મહેતા (સુરત)-માનવ ધર્મ સભાની સ્થાપના, કરસનદાસ મૂળજી (રાજકોટ) -વિદ્યાગુણ પ્રકાશ ધર્મ સભા મારફતે સમાજ સુધારાના પ્રયાસ, પુષ્પાબહેન મહેતા (રાજ-કોટ)- વિકાસગૃહ નામની સ્વરોજગારી આપતી સંસ્થાનો પ્રારંભ**

110. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા (1908) શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળાની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાથીઓએ કોની પ્રેરણાથી કરી હતી ? - **અરવિંદ ઘોષ**

111. ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહાનુભાવ એટલે - **કે.ટી. શાહ**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

112. ભારતના ક્રિકેટના ઓપનીંગ ટેસ્ટ ખેલાડી વિજય મરચન્ટની મૂળ અટક શું હતી ? - **ઠાકરસી**

113. ગુજરાત સૌથી પહેલી સૂતરાઉ કાપડની મિલના સ્થાપક .... હતા. - **શેઠ રણછોડભાઈ છોટાલાલ**

114. ડૉ. અમૃતા પટેલનું ક્યા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે ? - **ડેરી ઉદ્યોગ**

115. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? - **શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ**

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

116. ગુજરાતના બીજા રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? - **ધીરુભાઈ શાહ**

સબ ઑડિટર - 2015

117. ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? - **સાબરકાંઠા**

118. 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક ક્યા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ? - **શ્યામજીકૃષ્ણ વર્મા**

119. ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? - **ડૉ.રાજેન્દ્ર પ્રસાદ**

સબરજિસ્ટ્રાર - 2013

120. ગાંધીજી વિદેશમાંથી ભારત પરત પાછા ફર્યા તેની શતાબ્દી ? - **2015**

121. દેશની પ્રથમ મહિલા એડીશનલ સોલીસીટર તરીકે નિયુક્તિ ? - **ઈન્દિરા જયસિંહ**

122. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ... - **ટંકારા**

TAT - 2012

123. ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની આત્મકથાનું નામ શું છે? - **અગનપંખ**

HTAT - 2012

124. બાળ કેળવણીના ક્ષેત્રમાં ઘરશાળા દક્ષિણામૂર્તિના કેળવણી નૂતન વિચાર અને પ્રયોગશીલતા આપનાર નામો આપો. - **શ્રી હરભાઈ-શ્રી નાનાભાઈ**

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

125. 2જી ઓક્ટોબર કોનો જન્મ દિવસ છે? - **મહાત્મા ગાંધી**

PSI - 2012

126. ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા ક્યા ઉપનામ થી ઓળખાય છે? - **ચકોર**

127. અભયઘાટ કોની સમાધી સ્થળ છે ? - **મોરારજી દેસાઈ**

128. બુકર પ્રાઈઝ મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ હતાં ? - **અરૂધંતી રોય**

129. સ્ટીવ જોબ્સના અધિકૃત જીવનકથા સ્ટીવ જોબ્સના લેખક કોણ છે ? - **વોલ્ટર આઈજેક્સન**

આંકડાકીય અધિકારી - 2000

130. માઉન્ટ એવરેસ્ટ બીજી વખત સર કરનાર વિશ્વની સૌપ્રથમ મહિલા કોણ છે ? - **સંતોષ યાદવ**

131. ડૉ.મુરલી મનોહર જોષીએ શ્રીનગરમાં ક્યા સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ? - **લાલ ચોક**

132. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? - **લોર્ડ માઉન્ટ બેટન**

133. જન સંઘની સ્થાપના કોણે કરી હતી ? - **શ્યામાપ્રસાદ મુખરજી**

ચીફ ઓફિસર - 1999

134. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? - **ગણેશ માવળંકર**

135. ગાંધીજી પર પ્રભાવ પાડનાર અમેરિકન ચિંતક કોણ હતા ? - **રસ્કિન**

136. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ જણાવો. - **રાજઘાટ**

137. મહાદેવભાઈ દેસાઈનું જીવનકાર્ય જણાવો. - **ગાંધીજીના રહસ્યમંત્રી**

138. 'સાવિત્રી' મહાકાવ્યના રચયિતા કોણ છે ? - **અરવિંદ ઘોષ**

139. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા ? - **દાદાભાઈ નવરોજી**

140. નીચેનામાંથી પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ જણાવો. - **એની બેસન્ટ**

મેડિકલ ટ્યૂટર - 2000

141. દક્ષિણ આફ્રિકાના ગાંધીનું બહુમાન મળ્યું ? - **નેલ્સન મંડેલા**

142. સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ છે ? - **ફાતિમા બીબી**

આયુર્વેદિક ડોક્ટર - 2000

143. ગુજરાતના કલાગુરુ તરીકે ઓળખાતામાં આવે - **રવિશંકર રાવળ**

144. ડૉ.વિક્રમ સારાભાઈ, ત્રિભુવનભાઈ ગજ્જર, ઉપેન્દ્ર દેસાઈ ક્યા રાજ્યના વૈજ્ઞાનિકો છે ? - **ગુજરાત**

વૈદકિય સેવા - 2000

145. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક કોણ છે ? - **ડૉ.હેડગેવારજી**

146. મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? - **વિનોબા ભાવે**

147. કિસાનઘાટ કોનું સમાધિ સ્થળ છે ? - **ચૌધરી ચરણસિંહ**

148. સરહદના ગાંધી તરીકે ઓળખાય ? - **ખાન અબ્દુલ ગફાર ખાન**

149. પ્રિયદર્શિની તરીકે ક્યા મહિલા ઓળખાતા ? - **ઈન્દિરા ગાંધી**

150. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ક્યો આશ્રમ સ્થાપ્યો હતો ? - **ફિનિક્સ આશ્રમ**

151. ભારતીય લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? - **ગણેશ વાસુદેવ માવળંકર**

152. કલિકાલસર્વજ્ઞ કોને કહેવાય ? - **હેમચંદ્રાચાર્ય**

153. ગણેશ ઉત્સવ લોકપ્રિય બનાવવા કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો? - **લોકમાન્ય ટિળક**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

154. લજ્જાના લેખિકા કોણ છે? : **તસલિમા નસરીન**

155. સેતાનિક વર્સીસના લેખક સલમાન રશ્દિ મૂળ ક્યા દેશના છે ? : **ભારત**

156. ગુજરાતના ક્યા વ્યક્તિએ રંગ-રસાયણ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે? : **ત્રિભુવનદાસ ગજ્જર**

157. નાનજી દેશમુખ ક્યા ક્ષેત્રે કાર્યરત છે? : **ગ્રામ્ય વિકાસ**

158. કોને ઈન્ડિયન બિઝનેસમેન ઓફ ધી સેન્ચૂરી કહેવાય છે ? : **ધીરુભાઈ અંબાણી**

159. પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરસા મુંડાની જન્મતારીખ જણાવો. - **15 નવેમ્બર**

160. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? - **અંધશાળા**

161. મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. - **નડીયાદ**

162. 'વિનોબા ભાવે'નું પૂરું નામ જણાવો. - **વિનાયકરાવ ભાવે**

163. અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં ઈ.સ.1874માં 'મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ' કોની યાદમાં સ્થપાઈ છે ? - **મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી**

164. 'કલિકાલસર્વજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે ? - **આચાર્ય હેમચંદ્ર**

165. ....બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા તેમજ તેમને 'ડૉક્ટર ઓફ લિટરેચર'ની પદવી એનાયત થઈ હતી. - **આનંદશંકર ધ્રુવ**

166. 'અન ટુ ધિ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઈરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. - **રસ્કિન**

167. ભારતનાં પ્રથમ મહિલા ફોટોગ્રાફર કોણ હતા ? - **હોમી વ્યારાવાલા**

168. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે ક્યા અન્ય નામથી પણ પ્રચલિત હતું ? - **સુદામાપુરી**

169. નારાયણ સુર્વે કઈ ભાષાના પ્રસિદ્ધ કવિ છે ? - **મરાઠી**

170. બીજગણિતનો ઉપયોગ સૌપ્રથમ ક્યા ભારતીય દ્વારા કરવામાં આવ્યો ? - **આર્યભટ્ટ**

171. માણેકશા સૌરાબશાહ કોમિસરિયેત ક્યા વિદ્યાભ્યાસ સાથે સંકળાયેલા વિદ્વાન, અભ્યાસી, સંશોધક પ્રોફેસર હતા ? - **ઈતિહાસ**

172. ટ્રેડ યુનિયન આંદોલનની શરૂઆત કરતા ખુબ પહેલા ભારતના પ્રથમ મજદૂર નેતા તરીકે કોની ગણના થાય છે ? - **નાયરાણ મેઘજી લોખંડે**

173. 'કદંબ' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? - **કુમુદિની લાખિયા**

174. ઠક્કરબાપા મુખ્યત્વે ક્યા સામાજિક સમુહના કલ્યાણ માટે જાણીતા છે ? - **અનુસૂચિત જનજાતિ**

175. 'સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું'- આ ઉદ્ગારો કોના છે ? - **મહાત્મા ગાંધી**

176. Gandhian Approach to Social Work પુસ્તકના લેખક કોણ છે ? - **પ્રો.પી. દયાળ**

177. ગિવિંગ પ્લેજ સહી કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ? - **અઝીમ પ્રેમજી**

178. આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યું છે ? - **ઠક્કરબાપા**

179. જ્યોતિબા ફુલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી ? - **સત્યશોધક સમાજ**

180. વિનોબા ભાવેની કૃતિનું નામ જણાવો. - **શિક્ષણ વિચાર**

181. ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન કોણ ? - **હેતલ દવે**

182. બંસીલાલ વર્મા નામના ગુજરાતના કાર્ટુનિસ્ટ ક્યા નામે જાણીતા છે ? - **ચકોર**

183. 'ભાષા એટલે ધ્વનિસંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ' વ્યાખ્યા ક્યા તજજ્ઞે આપી ? - **સ્વીટ**

184. ભારતમાં માહિતી અધિકારનો કાયદો આવે તેની ચળવળ સાથે કોનું નામ સંકળાયેલું છે ? - **અરૂણા રોય**

185. ગ્લોબલ કોર્પોરેટ સીટીઝનશિપ માટેનો ખ્યાતનામ વુડ્રો વિલ્સન એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની ? - **ચંદા કોચર**

186. ભારતની પહેલી લોકસભાના પહેલા અધ્યક્ષ કોણ હતા ? - **ગણેશ વાસુદેવ માવળંકર**

187. ભારતના પહેલા શીખ પ્રધાનમંત્રી કોણ હતા ? - **મનમોહનસિંહ**

188. ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ? - **સુચેતા કૃપલાણી**

189. સુમતિ મોરારજી ક્યા ક્ષેત્રમાં યોગદાન માટે જાણીતા છે ? - **વહાણવટાનો ઉદ્યોગ**

190. ભારતના પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા ? - **ડૉ.ઝાકીર હુસૈન**

191. વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી ? - **મોરારજી દેસાઈ**

192. ભારતના રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળનાર પહેલી મહિલા કોણ છે ? - **ઈન્દિરા ગાંધી**

193. ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા હાઉસ ક્યા ગુજરાતીએ સ્થાપ્યું ? - **શ્યામજીકૃષ્ણ વર્મા**

194. ગુજરાતના સલીમ અલી શા કારણે ખ્યાતનામ થયા તે જણાવો. - **તેઓ અગ્રણી પક્ષીવિદ હતા.**

195. મહાત્મા ગાંધીના પરમ મિત્ર અને સમાજ સુધારક કે જે 'દિનબંધુ' તરીકે ઓળખાતા તેઓનું નામ શું છે ? - **ચાર્લ્સ એન્ડ્રુઝ**

196. આદિ જાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ........એ પ્રયોજ્યો હતો. - **ઠક્કર બાપા**

197. ભારતના પ્રથમ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ હતા ? - **વી. નરહરી રાવ**

198. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ? - **ગાંધીજી**

199. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી ? - **એલન ઓક્ટેવિયન હ્યુમ**

200. ગાંધીજીએ ક્યા લેખકને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા ? - **કાકા કાલેલકર**

201. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા ? - **વિદ્યાગૌરી નીલકંઠ**

202. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સેટેલાઈટ દ્વારા નવી ટેક્નોલોજી અને ભારતમાં સંદેશાવ્યવહારને આધુનિકતા આપનાર સામ પિત્રોડાનું મૂળ નામ શું હતું ? : **સત્યનારાયણ**

203. ભીલ સેવા સમાજના સ્થાપક કોણ છે ? - **ઠક્કરબાપા**

204. વિનોબા ભાવેના જીવનપ્રસંગોનું સંકલન ક્યા નામે કરવામાં આવેલ છે? : **અહિંસાની ખોજ**

205. 'અન ટુ ધિ લાસ્ટ' નામના પુસ્તકે ગાંધીજીને એટલા બધા મોહિત અને પરિવર્તિત કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? - **જહોન રસ્કીન**

206. પ્રાચીન ભારતમાં સૌપ્રથમ તબીબી સેવાઓના સુધારક ______ હતા. : **સુશ્રુતાચાર્ય**

207. અમદાવાદમાં સૌપ્રથમ કાપડમિલ કોણે સ્થાપી હતી ? : **રણછોડલાલ છોટાલાલ**

208. જ્યોતિસંઘના સ્થાપક કોણ છે ? - **મૃદુલા સારાભાઈ**

209. વિનોબા ભાવેનું જન્મસ્થળ જણાવો. : **ગાગોદા**

210. ક્યા સમાજસેવિકાને પંડિતાની માનવાચક પદવી અપાયેલી છે? - **રમાબાઈ**

સામાન્ય વિજ્ઞાન

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. માણસોમાં 'ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્ત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ?
A) કેલ્શિયમ B) મેગ્નેશિયમ C) ફ્લોરાઈડ D) કાર્બન
2. જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે ?
A) કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન
B) કાર્બન અને હાઈડ્રોજન
C) કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોજન
D) એમોનિયા અને હાઈડ્રોજન
3. સાચા જોડકા જોડો.

અ	બ
A) Ornithology	1. Body
B) Anthropology	2. Birds
C) Physiology	3. Plants
D) Botany	4. Man

A) A-2, B-4, C-3, D-1 B) A-4, B-1, C-2, D-3
C) A-3, B-4, C-2, D-1 D) A 2, B-4, C-1, D-3
4. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

A) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણ બળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ	1. રોબર્ટ બોઈલ
B) અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે.	2. રોબર્ટ હુક
C) કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણ વિજ ભારિત છે.	3. પાસ્કલ
D) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ	4. થોમસન અને ક્રુક્સ

A) D-1, B-3, A-2, C-4 B) A-4, D-3, C-1, B-2
C) A-3, C-2, D-1, B-4 D) B-1, C-4, A-2, D-3
5. કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ?
A) એલ્યુમિનિયમ B) લેડ
C) કોપર D) સિલ્વર
6. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

A) ટેલિફોન	1. રૂડોલ્ફ
B) વીજળીનો ગોળો	2. રાઈટ બ્રધર્સ
C) ડીઝલ એન્જિન	3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ
D) અરોપ્લેન	4. થોમસ એડિસન

A) B-1, C-2, A-4, D-3 B) C-2, D-1, A-4, B-3
C) D-1, C-3, B-4, A-2 D) A-3, C-1, D-2, B-4
7. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ......દ્વારા થાય છે.
A) બૃહદમસ્તિષ્ક B) લઘુમસ્તિષ્ક
C) મધ્ય મગજ D) લંબમજ્જા
8. ઈન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ ક્યું છે ?
A) સ્વાદુપિંડ B) જઠર C) યકૃત D) પિત્તાશય
9. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
A) વાતાવરણીય પરાવર્તન B) વાતાવરણીય વક્રીભવન
C) પરાવર્તન D) પૂર્ણ આંતરિક પરાવર્તન

રેવન્યૂ તલાટી - 28/02/2016

10. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) લોલકના નિયમો	1) રોન્ટજન
b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી	2) ગેલેલિયો
c) રૂધિર જૂથના શોધક	3) લોરી-બ્રોન્સ્ટેડ
d) ક્ષ-કિરણોના શોધક	4) કાર્લ લેન્ડસ્ટિનર

A) d-1, c-3, a-4, b-2 B) a-2, c-4, d-1, b-3
C) c-3, d-2, a-1, b-4 D) a-3, b-4, c 2, d-1
11. પ્રકાશવર્ષ શાનો એકમ છે ?
A) અંતર માપવાનો B) વર્ષ માપવાનો
C) ઝડપ માપવાનો D) પ્રકાશ માપવાનો
12. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) માઈક્રોસ્કોપ	1) ચાર્લ્સ બેબેજ
b) સ્ટીમ એન્જિન	2) સેમ્યુઅલ મોર્સ
c) કમ્પ્યૂટર	3) જેમ્સ વોટ
d) ટેલિગ્રાફ	4) ઝેડ. જન્સેન

A) d-1, c-2, b-3, a-4 B) b-1, c-2, d-4, b-3
C) b-3, d-2, a-4, c-1 D) c-4, a-1, b-4, d-3
13. : પ્રકાશ વર્ષ = ...A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ)
A) 63000 B) 5300
C) 9412 X 1010 D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
નોંધ : 1 પ્રકાશ વર્ષ = 63,241.1 A.U. થાય જેની નજીક 63,000 છે. તેથી ઓપ્શન A ધ્યાને લેવો

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

14. નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે?
A) ફોસ્ફરસ B) હિલીયમ C) બ્રોમીન D) ક્લોરીન
15. વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી?
A) ક્ષોભ મંડળ B) સમતાપ મંડળ
C) આયન મંડળ D) બાહ્ય મંડળ

1)C, 2)C, 3)D, 4)D, 5)B, 6)D, 7)D, 8)A, 9)B, 10)B, 11)A, 12)C, 13)A, 14)C, 15)B.

110. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ?
A) ક્ષુપ B) નીંદણ C) ઘાસ D) વૃક્ષ
111. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
A) શુક્ર B) પૃથ્વી C) મંગળ D) ગુરૂ
112. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
A) ચાંદી B) તાંબુ C) સોનુ D) પારો
113. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ?
A) CO_2 B) SO_2 C) H_2O D) O_2
114. પેન્સિલમાં શું વપરાય છે ?
A) ગ્રેફાઈટ B) સિલીકોન C) ફોસ્ફરસ D) કોલસો
115. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (Substance) કયો છે ?
A) સોનું B) લોખંડ C) હીરો D) પ્લેટિનમ
116. 'લાફીંગ ગેસ' (Laughing gas) એટલે કયો વાયું ?
A) કાર્બન મોનોક્સાઈડ B) સલ્ફર ડાયોક્સાઈડ
C) હાઈડ્રોજન પેરોક્સાઈડ D) નાઈટ્રસ ઓક્સાઈડ
117. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ?
A) રેડીયમ B) પારો C) જિંક D) યુરેનિયમ
118. કયા બ્લડગૃપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ?
A) A B) B C) O D) AB
119. સ્વાઈન ફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે ?
A) B1N1 B) C1D1 C) T1N1 D) H1N1
120. ગોબર ગેસમાં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે ?
A) ઈથેન B) મિથેન C) પ્રોપેન D) બ્યુટેન

બિન સચિવાલય ક્લાર્ક - 2016

121. મધમાખીના વિષ(ઝેર)માં કયો પદાર્થ હોય છે ?
A) લાઈમ B) કેલ્શિયમ ફોસ્ફેટ
C) મેલેટિન D) પેપ્સિન
122. નેનોંકણનું કદ કેટલું હોય છે ?
A) 10 થી 100 nm B) 1 થી 100 nm
C) 1 થી 1000 nm D) 1 થી 10 nm
123. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?
A) સ્ટીલ B) સ્ટેઈનલેસ સ્ટીલ
C) પિત્તળ(બ્રાસ) D) મેગ્નેલિયમ
124. ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ?
A) TV અને વોશિંગમશીન B) યંત્ર-મશીનરીમાંથી
C) ફ્રીઝ અને એરકંડીશનરમાંથી D) a,b અને c ત્રણેયમાંથી
125. સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ?
A) CO_2 અને પાણી B) ક્લોરોફિલ
C) સૂર્યપ્રકાશ D) (A),(B) અને (C) ત્રણેય
126. ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?
A) 110V, 60Hz B) 110V, 50Hz
C) 220V, 50Hz D) 220V, 60Hz
127. હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ?
A) હેન્રી કેવેન્ડીશ B) લેવોઝિયર C) બોઈલ D) હેબર
128. શરીરનાં કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O_2યુક્ત બને છે.)
A) હૃદય B) ફેફસાં C) કર્ણક D) ક્ષેપક
129. આઈન્સ્ટાઈનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો.
A) $E = \Delta mc^2$ B) $E = cm^2$ C) $E = \Delta mc$ D) $E = \Delta cm^2$
130. રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ...... છે.
A) પોલિથીન B) PVC
C) ટેફલોન D) પોલિબ્યુટાડાઈન
131. ખાલી જગ્યા પૂરો.
તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર -
R = ... C જ્યાં, R= રૂમર (Reaumur) C= સેલ્સિયસ (Celsius)
A) 3/4 B) 4/5 C) 2/5 D) 5/4
132. સામાન્ય તાપમાને (30°Cથી વધુ)નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ?
A) સોડિયમ B) ગેલિયમ C) ટિન D) યુરેનિયમ
133. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ......... છે.
A) 4.5 m B) 1.5 m C) 3.5 m D) 6.5 m
134. ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ?
A) મરીચિકા B) વક્રીભવન C) લૂમિંગ D) વિભાજન
135. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80 % ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?
A) ક્લોરાઈડ આયન B) સલ્ફર આયન
C) ક્લોરોફ્લોરો કાર્બન D) મેગ્નેશિયમ આયન
136. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે ?
A) એપિકલ્ચર B) હોર્ટિકલ્ચર C) સેરીકલ્ચર D) એગ્રીકલ્ચર
137. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. "આવર્તનિયમ"	1) નિલ્સ બોહર
b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલા	2) ડૉ.સી.વી.રામન
c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર	3) કાર્લ લિનિયસ
d) તત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઈલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર	4) મેન્ડેલિફ

A) d-1, b-3, c-2, a-4 B) b-2, a-1, d-3, c-4
C) c-3, d-4, a-1, b-2 D) a-2, b-3, d-1, c-4

110)B, 111)A, 112)D, 113)C, 114)A, 115)C, 116)D, 117)B, 118)C, 119)D, 120)B, 121)C, 122)B, 123)C, 124)C, 125)D, 126)C, 127)A, 128)B, 129)A, 130)C, 131)B, 132)B, 133)D, 134)C, 135)C, 136)C, 137)A.

138. તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?
A) ન્યુક્લિયર સંલયન B) કોસ્મિક
C) ન્યુક્લિયર વિખંડન D) સુપરનોવા

139. ....ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.
A) પ્રોફેસર તલસાણે B) પ્રોફેસર આયંગર
C) પ્રકૃતિવિદ્ લિનિયસ D) પ્રોફેસર થિઓ ફેસ્ટર

બિન, સચિવાલય ક્લાર્ક - 21/12/2014

140. નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ?
A) કોલટાર B) ગેસોલીન C) આસ્ફાલ્ટ D) કોક

141. જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર ક્યું છે ?
A) $CaSO_4$ B) $CaSO_4.H_2O$
C) $CaSO_4.7H_2O$ D) $CaSO_4.2H_2O$

142. કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે ?
A) 5% B) 7% C) 10% D) 12%

143. અવરોધનો એકમ શું છે ?
A) વોલ્ટ B) જૂલ C) કુલંબ D) ઓહ્મ

144. ઓઝોન સ્તર ક્યા વિકિરણોનું શોષણ કરે છે?
A) પારજાંબલી B) ઈન્ફ્રાસોનિક
C) અલ્ટ્રાસોનિક D) પારરક્ત

145. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ?
A) 22 B) 23 C) 46 D) 50

146. પ્રકાશનો હવામાં વેગ .... માઈલ્સ/સેકન્ડ
A) 3 લાખ B) 18600 C) 186000 D) 3 x 106

147. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન ક્યા સ્પેસ સેન્ટર પરથી કરે છે ?
A) થુંબા B) ઈસરો C) કેનેડી D) નાસા

148. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ?
A) ત્રિદલ વાલ્વ B) દ્વિદલ વાલ્વ
C) અર્ધચંદ્રાકાર વાલ્વ D) (A) અને (B) બન્ને

149. નીચેમાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ?
A) સોડિયમ B) પારો C) ગેલિયમ D) એક પણ નહી

150. CRTનું પૂરું નામ શું છે ?
A) કેથોડ રેમ ટેસ્ટ B) કેથોડ રે ટ્યુબ
C) કેથોડ રાઈટ ટ્યૂબ D) કમ્પ્યૂટર રિસ્ટાર્ટ ટેસ્ટિંગ

151. ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે?
A) પિત્તળ B) લેડ
C) લેડ-ટિનની મિશ્રધાતુ D) A અને B બન્ને

152. નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે?
A) હીરો B) પાણી C) કાચ D) મોતી

GPSC પ્રિલિમ - 2001

153. સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કયો ?
A) બુધ B) મંગળ C) ગુરુ D) શુક્ર

154. કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?
A) જન્માષ્ટમી B) અમાસ C) પૂનમ D) રામનવમી

155. ક્યું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ?
A) બ્લેક બોક્સ B) સ્પીડો મીટર C) એરોમીટર D) બેરોમીટર

156. ભૂકંપની નોંધ ક્યું સાધન લે છે ?
A) ટેલિગ્રાફ B) સીસ્મોગ્રાફ C) થર્મોગ્રાફ D) કાર્ડિયોગ્રામ

157. આમાનું ક્યું બ્લડ ગ્રુપ નથી ?
A) A+ B) B+ C) C+ D) A-

158. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ?
A) એલેક્ઝાંડર બેલ B) બ્રેઈલ લુઈસ
C) એડિસન D) આઈઝેક પીટમેન

159. આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ?
A) શીતળાની રસી B) એટમ બોમ્બ
C) સાક્ષેતાવાદનો સિદ્ધાંત D) ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત

160. આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ?
A) પેરાસીટામોલ B) એનાસીન
C) ક્વિનાઈન D) પેનિસિલિન

161. મેરીના કયા પ્રાણીની ઓલાદ છે ?
A) કુતરો B) ઘોડો C) ઘેટું D) ગાય

162. એનીમિયા (પાંડુરોગ) ક્યાં તત્વના અભાવે થાય છે ?
A) કેલ્શિયમ B) ખાંડ C) આયોડિન D) લોહ

163. આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે ?
A) ECG B) BCG C) TB D) ડાયાલિસિસ

164. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ?
A) કરોડરજ્જુ B) નાનુ મગજ C) હૃદય D) કાન

165. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યા નિયમ પર કામ કરે છે ?
A) ઓહમનો નિયમ B) હૂકનો નિયમ
C) ન્યૂટનનો નિયમ D) આર્કિમિડિઝનો નિયમ

166. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
A) સોળ B) ભાવીસ C) ચોવીસ D) બાર

167. કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ?
A) પેનિસિલિન B) ક્લોરોમાઈસેટિન
C) સ્ટેરોઈડ. D) ક્વિનાઈન

138)A, 139)B, 140)C, 141)D, 142)A, 143)D, 144)A, 145)C, 146)C, 147)C, 148)D, 149)A, 150)B, 151)C, 152)A, 153)C, 154)C, 155)A, 156)B, 157)C, 158)B, 159)C, 160)C, 161)C, 162)D, 163)A, 164)B, 165)B, 166)C, 167)C.

168. અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે ?
A) રીચ્ટર B) ડેસીબલ C) સેન્ટિગ્રેડ D) હરટ્ઝ

169. ન્યુકલીઅર પાવર એકમમાં કયું બળતણ વપરાય ?
A) કેલ્શિયમ B) કોલસો C) સી.એન.જી. D) યુરેનિયમ

170. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ?
A) કેમોથેરપી B) બાયોસ્કોપ C) લેપ્રોસ્કોપી D) સ્ટેથોસ્કોપી

171. ડાયાલિસીસની સારવાર કયા દર્દમાં અપાય ?
A) હૃદયના B) કિડનીના
C) ડાયાબિટીસના D) કમળાના

172. પાણી કયાં બે તત્વોનું બનેલું છે ?
A) હાઈડ્રોજન, ઓક્સિજન B) હાઈડ્રોજન-નાઈટ્રોજન
C) હાઈડ્રોજન-કાર્બન D) ઓક્સિજન-કાર્બન

173. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ?
A) થાઈરોઈડ B) શ્વેતકણ
C) ઈન્સ્યુલિન D) હિમોગ્લોબિન

174. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે ?
A) ચાંચડ B) માખી C) મચ્છર D) તીડ

175. લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે ?
A) મીટર B) લીટર C) ફૂટ D) માઈલ

176. ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
A) ચામડી B) ફેફસા C) હૃદય D) કિડની

GPSC પ્રિલિમ - 2007

177. સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો છે ?
A) શુક્ર B) હર્ષલ C) બુધ D) મંગળ

178. વિટામીન Aની ઉણપથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે?
A) લીવર B) કીડની C) ત્વચા D) આંખ

179. 'પીડિયાટ્રીશિયન' નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાંત હોય છે?
A) બાળકોના B) યુવાનો C) વૃદ્ધોના D) સ્ત્રીઓના

180. ઓપ્થેલમોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે ?
A) આંખ B) કાન C) ગળું D) પગ

181. રસીકરણની (વેક્સિનેશન) શોધ કોણે કરી ?
A) જોસેફ લીસ્ટર B) એડવર્ડ જેનર
C) જહોન હંટર D) પીટર ફ્રેન્ક

182. પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો.
A) પ્લૂટો B) ચંદ્ર C) શુક્ર D) મંગળ

183. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ?
A) ન્યૂટન B) દા વિન્ચી C) ગેલિલિયો D) કોપરનિકસ

184. ડાયનોસર શું છે ?
A) એક ટાપુ B) અવકાશયાન
C) પ્રાગ ઐતિહાસિક પ્રાણી D) એક રોગ

185. નીચેનામાંથી કયા ફળમાં વિટામીન 'સી' હોય છે ?
A) કેળું B) ચીકું C) નારંગી D) સફરજન

186. DNAને આમાંથી કોની સાથે સંબંધ છે ?
A) દેશ B) પરંપરા C) વંશ D) ધર્મ

187. પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?
A) 80 B) 90 C) 95 D) 100

188. 'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં કરાય છે ?
A) કેન્સર B) એઈડ્ઝ C) હાર્ટ સર્જરી D) ન્યૂમોનિયા

189. ટેલિફોનની શોધ કોણે કરી ?
A) રૂડોલ્ફ ડીઝલ B) એલેકઝાન્ડર બેલ
C) જેમ્સ વોટ D) થોમસ એડીસન

190. સુપર સોનિક એટલે શું ?
A) ઘોંઘાટ B) ધીમો અવાજ
C) અવાજથી વધારે ઝડપ D) પડઘો

191. નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી?
A) કાર્ડિયોગ્રામ B) લેપ્રોસ્કોપી C) ડાયાલિસિસ D) સિસ્મોગ્રાફ

192. હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ?
A) 8 B) 5 C) 4 D) 0.2

193. આમાં શું બંધબેસતું નથી ?
A) સી.એન.જી. B) પેટ્રોલ
C) ક્લોરિન ગેસ D) ડીઝલ

194. CNG શું છે ?
A) કાર નેચરલ ગેસ B) કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ
C) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ D) કોમ્પ્યુટરાઈઝ્ડ નેચરલ ગેસ

GPSC પ્રિલિમ - 2014

195. નીચે રાસાયણિક તત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ?
A) ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી
B) મેંગેનિઝ - જોહાન ગ્હાન
C) નાઈટ્રોજન - ડેનિયલ રૂધરફોર્ડ
D) સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ

196. નીચે આપેલ ભાગ - I અને ભાગ - IIને જોડતાં સાચો જવાબ શું થશે ?

ભાગ - I (રત્નો/ઉપરત્નો)	ભાગ - II (વિશિષ્ટ ઘનતા)
1. અંબર	અ. 3.73
2. હીરો	બ. 2.7
3. કાયસોબેરિલ	ક. 3.52
4. મોતી	ડ. 3.60
	ઈ. 1.05

A) 1-અ, 2-ક, 3-અ, 4-બ B) 1-બ, 2-ડ, 3-ઈ, 4-અ
C) 1-ક, 2-અ, 3-ડ, 4-બ D) 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક

168)B, 169)D, 170)C, 171)B, 172)A, 173)C, 174)A, 175)B, 176)B, 177)C, 178)D, 179)A, 180)A, 181)B, 182)B, 183)A, 184)C, 185)C, 186)C, 187)D, 188)A, 189)B, 190)C, 191)D, 192)D, 193)C, 194)C, 195)A, 196)A.

197. વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક
A) ક્રેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ
B) દૂરબીન અને વરાહમિહીર
C) માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી
D) ટેલિસ્કોપ અને ગેલેલિયો

198. નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે ?
A) ડાયક્લોરો ડાઈમીથાઈલ ટ્રાઈક્લોરોઈથેન
B) ડાયક્લોરો ડાઈઈથાઈલ ટ્રાઈક્લોરોમીથાઈલ
C) ડાયક્લોરો ડાઈક્વિનાઈન ટ્રાઈબોરોઈથેન
D) ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાઈક્લોરોઈથેન

199. લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ?
A) સલ્ફર ડાયોક્સાઈડ B) હાઈડ્રોજન પેરોક્સાઈડ
C) કાર્બન મોનોક્સાઈડ D) નાઈટ્રસ ઓક્સાઈડ

200. એમોનિયમ સાયનેટને ગરમ કરીને યૂરિયાના સંયોજન બનાવનાર કોણ હતા ?
A) મારિન રાઉલે B) મેન્ડેલિફ
C) હિલેઈર D) ફ્રેડરિક વ્હોલર

201. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ?
A) ડાયનેમો B) ઘડિયાળનું લોલક
C) પંખો D) પાણીની મોટર

202. ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ?
A) એરિસ્ટોટલ B) નિકોલસ કોપરનિક્સ
C) લાઈબ્નિત્ઝ D) થેઈલ્સ

203. મુખ્ય વિટામિનો અને તેની ઉણપથી થતાં રોગોની કઈ જોડી સાચી છે?
A) વિટામિન - બી - રક્તસ્રાવ (લોહી વહેવું)
B) વિટામિન-સી - આંખના રોગો
C) વિટામિન-ડી - અસ્થિ રોગ, સુક્તાન
D) વિટામિન-એ - કાનના રોગો

204. ગન પાવડર શામાંથી બને છે ?
A) ચારકોલ, મીઠું અને પાવડર
B) મીઠું, એસિડ અને ખાંડ
C) સલ્ફર, ચારકોલ અને મીઠું
D) સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ

205. ઈબોલા (Ebola) શું છે ?
A) પ્રખ્યાત એથલેટ
B) રોગચાળો પ્રસરાવતો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે
C) અમેરિકાનું એક શહેર
D) એમેઝોન જંગલોમાં વસતું એક પ્રાણી

PSI ખાતાકીય - 23/04/2017

206. બરફનું ગલનબિંદુ કેટલું છે ?
A) 100^0 સે. B) 80^0 સે. C) 0^0 સે. D) 10^0 સે.

207. વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ?
A) અંશમાં B) મીમી/સેમી. ઈંચમાં
C) ફૂટમાં D) ચો.મી.માં

208. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ?
A) 18% B) 20.96 % C) 78 % D) 0.04 %

209. મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે?
A) ચાર B) પાંચ C) આઠ D) નવ

210. નીચેનામાંથી ક્યા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ?
A) મીઠું B) નવસાર C) બરફ D) તાંબુ

211. સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?
A) એમોનીયો B) ફટકડી (એલમ)
C) ફેરીક ક્લોરાઈડ D) કળી ચૂનો

212. 'હોકાર્યંત્ર'નો ઉપયોગ શું છે ?
A) દરિયાની ઊંડાઈ માપવા B) વિમાનની ઊંચાઈ માપવા
C) દિશા જાણવા D) વાતાવરણનું દબાણ માપવા

213. પીવાલાયક પાણીનો pH આંક.
A) એસિડિક હોય B) બેઝીક હોય
C) તટસ્થ હોય D) કોઈપણ હોઈ શકે

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

214. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવાની પધ્ધતિને શું કહેવાય છે?
A) એપીકલ્ચર B) ટેક્સીડરમી C) સીલ્વીકલ્ચર D) ટીસ્યુકલ્ચર

215. 'અળસીયા'નું લિંગ જણાવો.
A) સ્ત્રીલીંગ B) પૂલીંગ
C) ઉભય લીંગી D) લીંગ સિવાયનું

216. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?
A) 1.03 B) 0.003 C) 0.03 D) 0.30

217. પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ....છે.
A) વક્રીભવન B) પરાવર્તન C) ધ્રુવીભવન D) વિભાજન

218. લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
A) અશ્વગંધા B) સર્પગંધા C) ગળો D) કરંજ

219. 'એડીસ' મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે?
A) મેલેરીયા B) હાથીપગો C) ડેન્ગ્યુ D) ટાઈફોઈડ

197)A, 198)D, 199)D, 200)D, 201)A, 202)A, 203)C, 204)D, 205)B, 206)C, 207)B, 208)B, 209)B, 210)B, 211)B, 212)C, 213)C, 214)B, 215)C, 216)C, 217)A, 218)B, 219)C.

220. નિસ્યંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા - pH કેટલી હોય છે?
A)6 B)7 C)8 D)14

221. 'ડેસિબલ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે?
A)પવન B)પ્રકાશ C)વિજળી D)અવાજ

222. જમીન વગર ખેતી કરવાની પધ્ધતિને શું કહે છે?
A)કિચન ગાર્ડન B)બરીડ સિંચાઈ
C)હાઈડ્રોપોનિકસ D)એપીકલ્ચર

PSI/ASI GK - 2/5/2015

223. હેવી વોટરનું બીજું નામ શું છે ?
A)હેવીરેમ B)સોનેરીયમ C)ડ્યુટેરીયમ D)યુગોરીમ

224. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?
A)પ્રકાશ તિવ્રતા B)સમય
C)અંતર D)પ્રકાશની શક્તિ

225. એક્સ-રેની શોધ કોણે કરી હતી ?
A)ઝેનર B)મેડમ ક્યુરી
C)રોન્ટેઝન D)આર્કીમીડીઝ

226. સુકો બરફ કોને કહે છે ?
A)આઈસોકસાઈડ B)ડીસ્ટીલ વોટર
C)સલ્ફર ડાયોકસાઈડ D)ઘન કાર્બોડાયોકસાઈડ

227. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
A)શુક્ર B)ગુરૂ C)બુધ D)નેપ્ચ્યુન

228. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?
A)અણુ બોમ્બ B)હાઈડ્રોજન બોમ્બ
C)ન્યુટ્રોન બોમ્બ D)ત્રણમાંથી કોઈ નહીં

229. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?
A)આર્કીમીડીઝ B) યુકલીડ C)એરીસ્ટોટલ
D)પ્લેટો

230. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
A)સી.બી.ટી.એસ. B)એચ.આઈ.વી.
C)એલીસા (Elisa) D)એસ.જી.પી.ટી.

231. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?
A)ક્રીશ્ચન બર્નાડ B)માર્ટીન ક્લાઈવ
C)રોબર્ટ વેલનબર્ગ D)એલેક્ઝાંડર ફ્લેમિંગ

232. આગ ઓલવવા કયા વાયુની જરૂર છે.
A)નાઈટ્રોજન B)અંગારવાયુ C)ઓક્સિજન D)ક્લોરિન

233. મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?
A)બે B)ત્રણ C)ચાર D)એક

234. લીફ્ટની શોધ કોણે કરી છે ?
A)જોસેફ સ્વાન B)પીટર ગોલ્ડમાર્ક
C)એલિસા ઓટીસ D)બ્રુસ્નેલ ઓટીસ

235. સર્પગંધામાંથી શું મળી આવે છે ?
A)રીસ્પીન B)નિકોટીન C)મોર્ફીન D)ક્વિનાઈન

236. લેસર (LASER)નું પુરૂ નામ શું છે ?
A)લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
B)લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
C)લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએક્ટીવીટી
D)આમાનું કોઈ પણ નહીં

237. સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
A)હવાની ગતિ B)અવાજની ગતિથી વધારે ગતિ
C)અવાજની ગતિથી ઓછી ગતિ D)ત્રણમાંથી એક પણ નહીં

238. એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?
A)બેકટેરીયા B)વાઈરસ C)ફુગ D)પ્રજીવક

GPSC Class-1 - 2016

239. રિકેટ્સ (Rickets) રોગ કયા પ્રકારના વિટામીનની ઉણપથી થાય છે ?
A)વિટામિન - A B)વિટામિન - B
C)વિટામિન - C D)વિટામિન - D

240. એસિડવર્ષા (Acid-rain)માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ?
A)એસેટીક એસિડ B)સલ્ફ્યુરિક એસિડ
C)હાઈડ્રોક્લોરિક એસિડ D)ઝિંક ક્લોરાઈડ

241. સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ?
A)ગુરૂ B)શુક્ર C)શનિ D)બુધ

242. વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ?
A)ઈલેક્ટ્રીક જનરેટર B)સોલેનોઈડ
C)ઈલેક્ટ્રીક મોટર D)ઈલેક્ટ્રિક ઈસ્ત્રી

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

243. વોશીંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. (Washing Machine)
A)કેન્દ્રત્યાગી - centrifugation
B)ડાયાલિસિસ- dialysis
C)રીવર્સ અભિસરણ- reverse osmosis
D)પ્રસાર, ફેલાવો- diffusion

244. જર્મન સીલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી?
A)તાંબુ B)નિકલ C)જસત D)સિલ્વર

220)B, 221)D, 222)C, 223)C, 224)C, 225)C, 226)D, 227)A, 228)B, 229)A, 230)C, 231)A, 232)B, 233)B, 234)C, 235)A, 236)B, 237)B, 238)A, 239)D, 240)B, 241)A, 242)C, 243)A, 244)D.

245. RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનીકે કરેલ હતી?

A) ઓસ્ટ્રેલિયા-વિલફેડ B) ફ્રાન્સ-હેમીંગ

C) જર્મન-હેનિંગે D) સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ

246. સાયકલ અને અન્ય વાહનોમાં બોલ બેરીંગ વપરાય છે કારણ કે -

A) પૈડું અને એકસલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતી વધે છે.

B) પૈડું અને એકસલ વચ્ચેનો વિસ્તાર વધે છે અને ગતી વધે છે.

C) એકસલ અને પૈડા વચ્ચેનો ઈફેકટીવ એરીયા ઘટે છે.

D) A અને C

247. ઓપ્ટીકલ ફાયબર (optical fibre) કયા સિદ્ધાંત ઉપર કામગીરી કરે છે.

A) Total internal reflection આંતરિક પરાવર્તન

B) Refraction પ્રકાશના કિરણોનું અલગ અલગ દિશામાં પ્રત્યાવર્તન

C) Scattering સ્કેટરિંગ-વિખેરવું

D) Interference ખલલગીરી કરવી

248. નીચેના વાકયો વાંચો-

1) એક માણસ પાણીમાં પડેલ સીક્કાને જુવે છે અને તે સીક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે.

B) એક માણસ પાણીમાંથી પાણી ઉપર રહેલ સીક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સીક્કો દેખાય છે.

ઉપરોક્ત પૈકી કયું વાકય /વાકયો સાચા છે.

A) 1 B) 2

C) 1 અને 2 D) i અને 2 પૈકી એકપણ નહી

249. 100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે?

A) સાંભળી શકાય તેવો અવાજ B) સામાન્ય સંવાદ/સંભાષણ

C) ગીચ શેરીઓનો અવાજ D) મશીન શોપમાંથી આવતો અવાજ

250. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજ ની ઝડપ સૌથી વધારે રહે છે?

A) O^0 cetigrade વાળી હવા B) 100^0 cetigrade વાળી હવા

C) પાણી D) લાકડું

251. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ "Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે?

A) 220 K B) 273 K C) 6500 K D) 9000 K

252. વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop One" નો અર્થ શું થાય છે?

1) માણસો અને સામાનનું, વિમાનની ગતીથી પણ જમીન ઉપર વહન કરવું

2) કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ

A) પ્રથમ વાકય B) બીજુ વાકય

C) પ્રથમ અને બીજુ વાકય D) ઉપરોક્ત પૈકી એકપણ નહી

GPSC Class - 2 - 29/1/2017

253. નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચુ નથી?

શોધ	શોધક
A) ડીઝલ એન્જિન	- રૂડોલ્ફ ડીઝલ
B) સિમેન્ટ	- જોસેફ આસ્ફડીન
C) ઈલેક્ટ્રીસીટી	- માયકલ ફેરોડે
D) કોમ્પ્યુટર	- રોબર્ટ વિલ્હેમ

254. સૂર્યમંડળમાં નાનામો નાનો ગ્રહ કયો છે?

A) મંગળ B) બુધ C) પૃથ્વી D) પ્લુટો

255. નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે?

A) લોખંડનું કાટવું B) પાણીનું થીજી જવું

C) કોલસાનું બળવું D) મલાઈ ખાટું થઈ જવું

256. અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે?

A) સફેદ B) કાળો

C) ઘેરો વાદળી D) વાદળી-લીલો

257. માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે?

A) કેબલ B) માઈક્રોવેવ્સ્

C) રેડિઓવેવ્સ્ D) ઓપ્ટિકલ ફાઈબર

258. નીચે દર્શાવેલ પૈકી ઝડપના સંદર્ભમાં કોની સાથે "Mach number" નો ઉપયોગ થાય છે?

A) અવકાશયાન B) વિમાન

C) અવાજ D) વહાણો

259. સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે?

A) યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી

B) હાઈડ્રોજનના સંયોજનથી

C) હિલિયમના સંયોજનથી

D) ઉપર પૈકી એકપણ નહી

260. આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે?

A) રેડિયોએક્ટીવાટી અને ફોટોઈલેક્ટ્રીક અસર

B) રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત

C) સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રીક અસર

D) ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રીક અસર

261. "સૂકો બરફ" (Dry Ice) એ રાસાયણિક રીતે શું છે?

A) ઘન કાર્બન ડાયોક્સાઈડ

B) ઘન સલ્ફર ડાયોક્સાઈડ

C) શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ

D) બરફ અને સાદા મીઠાનું મિશ્રણ

245)C, 246)D, 247)A, 248)C, 249)D, 250)D, 251)C, 252)A, 253)D, 254)B, 255)B, 256)B, 257)C, 258)B, 259)B, 260)C, 261)A.

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

262. નીચેના પૈકી ક્યું વિટામીન છે?
A) ઈન્સીયુલીન B) એડ્રીનાલીન
C) રીબોફ્લાવીન D) કેરાટીન

263. બેકીંગ સોડા છે.........
A) સોડીયમ કાર્બોનેટ B) સોડીયમ બાયકાર્બોનેટ
C) કેલ્શીયમ કાર્બોનેટ D) સોડીયમ થીઓસલ્ફેટ

264. નીચેના પૈકી સૌથી શકિતશાળી બળ કયું છે?
A) પરમાણુ બળ B) અણુ બળ
C) વીજ ચુંબકીય બળ D) ગુરુત્વાકર્ષણ બળ

265. ક્યો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે?
A) ધૂમકેતુ B) ઉલ્કા C) ઉલ્કાશીલા D) લઘુગ્રહ

266. વર્ષાઋતુમાં મેઘધનુષ્યની રચનામાં નીચેની ઘટના બને છે?
A) સૂર્ય કિરણોનું વક્રીભવન
B) સૂર્ય કિરણોનું વિભાજન
C) સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન
D) ઉપરની તમામ ઘટનાઓ

267. આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા ક્યા નામથી ઓળખાય છે?
A) જનીનવિદ્યા B) ઉત્ક્રાંતિવિદ્યા
C) વર્ગીકરણવિદ્યા D) સજીવવિદ્યા

268. ક્યા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે?
A) કાચબો B) ગરોળી C) તિતિઘોડો D) મનુષ્ય

269. કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા.......પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A) વેટ સ્ક્રબર્સ B) શોષણ પદ્ધતિ
C) ગુરૂત્વાકર્ષણ પદ્ધતિ D) વીજ-પ્રસ્થાપિત અવક્ષેપક

270. નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે?
A) સોડિયમ B) ગેલિયમ C) ટિન D) યુરેનિયમ

GPSC Class - 2 - 18/12/2016

271. પિરિયોડિક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક (Atomic Number) ધરાવતા રસાયણ/ઘટકનું નામ શું છે?
A) નિહોનિયમ - Nihonium B) મોસ્કોવિયમ -Moscovium
C) ટેનેસાઈન - Tennesssine D) ઓગેનેસોન - Oganesson

272. ટીઅર-ગેસનું રાસાયણિક નામ શું છે?
A) સોડીયમ ન્યુકિલઓટાઈડલ B) આલ્ફા ક્લોરોઅસિટોફેનન
C) સિલ્વર બિટાટ્રાયોમાઈડ D) ઉપરોક્ત એક પણ નહી

273. ઘી (Ghee)માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે?
A) સિલ્વર ક્રોમાઈટ B) સોડિયમ બાયોક્રોમાઈટ
C) સોડિયમ બેન્ટોનાઈટ D) પ્રવાહી આયોડીન

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

274. પેનિસિલિનનાં શોધક કોણ હતા?
A) ડૉ. જગદીશચંદ્ર બોઝ B) ગ્રેગરી મેન્ડલ
C) એ. ફ્લેમીંગ D) લૂઈ પાશ્ચર

275. હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે?
A) ઓક્સિજન B) કાર્બન ડાયોક્સાઈડ
C) ઓઝોન D) નાઈટ્રોજન

276. વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી ક્યા યંત્રનો ઉપયોગ થાય છે?
A) ગેલ્વેનોમીટર B) ઈલેક્ટ્રોમીટર
C) એમીટર D) થર્મોમીટર

277. માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?
A) 44 B) 46 C) 48 D) 52

278. એક્રોફોબીયા (Acrophobia) કઈ બાબત અંગેનો ડર છે?
A) સમુદ્ર B) ઊંડાણો C) કલ્પો D) ઊંચાઈ

GPSC Class - 2 - 12/2/2017

279. માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે -
A) ઓછું કામ થાય છે.
B) સમાન કામ માટે ઓછુ બળ વાપરવુ પડે છે.
C) સમાન કામ ઝડપથી થાય છે.
D) સમાન કામ માટે વધારે વાપરવું પડે છે.

280. પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે?
A) હિરામાંથી કાચમાં B) પાણીમાંથી કાચમાં
C) હવામાંથી પાણીમાં D) હવામાંથી કાચમાં

281. સૌથી હલકુ, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતુ તત્વ કયું છે?
A) ઓક્સિજન B) ક્લોરિન C) હાઈડ્રોજન D) લિથિયમ

282. વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે?
A) યુડોમીટર B) ટેકોમીટર C) સેક્રોમીટર D) સ્પીડોમીટર

283. નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલ હતી?
A) સેફ્ટી લેમ્પ B) ફાઉન્ટન પેન
C) ડાયનામાઈટ D) ટેરી કોટ

284. ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે?
A) હાર્ડવેર B) નેટવર્ક
C) સોફ્ટવેર D) ઉપરોક્ત પૈકી કોઈપણ નહીં

262)C, 263)B, 264)A, 265)B, 266)D, 267)A, 268)B, 269)A, 270)B, 271)D, 272)B, 273)D, 274)C, 275)D, 276)C, 277)B, 278)D, 279)B, 280)A, 281)C, 282)A, 283)C, 284)B.

GPSC Class - 2 - 28/1/2017

285. વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ (Diffusion) કયા કારણસર થાય છે?
A) કાર્બન ડાયોક્સાઈડ B) ધુળના રજકણો
C) હીલીયમ (Helium) D) પાણીની વરાળ

286. નાઈટ વિઝન સાધનો (Night Vision Apparatus) માં કયા મોજાઓ નો ઉપયોગ થાય છે?
A) રેડીયો વેવ (Redio Waves) B) માઈક્રો વેવ (Micro Waves)
C) ઈન્ફ્રા-રેડ વેવ (Infra-red Waves)
D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહી

287. ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે?
A) લાઈટ વેવ (Light Waves)
B) સાઉન્ડ વેવ (Sound Waves)
C) માઈક્રો વેવ (Micro Waves)
D) રેડીયો વેવ (Redio Waves)

288. નીચે જણાવેલ પાકો (Crops) પૈકી કયા પાક ઈથેનોલ (Ethanol) બનાવવામાં વધારે ઉપયોગી થાય છે?
A) જેટ્રોફા (Jetropha) B) મકાઈ (Maize)
C) સૂર્યમુખી (Sun-Flower) D) કેરી (Mango)

289. H_1N_1 વાયરસને નીચેના પૈકી કયા રોગ (Diseases) સાથે સંબંધ છે?
A) એઈડ્સ (AIDS) B) બર્ડ ફ્લુ (Bird Flu)
C) ડેંગ્યુ (Dangue) D) સ્વાઈન ફ્લુ (Swine Flu)

GPSC Class-1 - 15/01/2017

290. ઑપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
A) પ્રકાશનું આંશિક આંતરિક પરાવર્તન
B) પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન
C) પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન
D) પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન

291. સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય?
A) હિલિયોપથી B) હાઈડ્રોપથી
C) હોમિયોપથી D) નેચરોપથી

292. ઓલેરી કલ્ચર એટલે શું થાય?
A) ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન
B) શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન
C) તેલ ધરાવતા છોડમાંથી બાયો-ડિઝલ મેળવવાનું વિજ્ઞાન
D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

293. સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે?
A) નેફોમીટર B) હાઈડ્રોમીટર
C) વોલ્ટમીટર D) પાઈરોમીટર

GPSC Class-1 - 15/01/2017

294. 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે.........કિલો કેલરી શકિત પૂરી પાડે છે.
A) 8 B) 6 C) 7 D) 4

295. આહારના મૂળભૂત ઘટકોને............કહે છે.
A) શર્કરા B) પોષક ઘટકો C) ચયાપચય D) પાણી

296. આપણા શરીરને શકિતની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો...........માંથી મળે છે.
A) પ્રોટીન અને કેલ્સિયમ B) ચરબી અને પાણી
C) કાર્બોદિત પદાર્થો અને ચરબી D) કેલ્શિયમ અને ફોસ્ફરસ

297. ઉત્સેચકો ....ના બનેલા હોય છે.
A) પાણી B) પ્રોટીન
C) વિટામીન - એ D) વિટામીન - સી

298. વિટામીન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ....ની જરૂર પડે છે.
A) ચરબી B) પાણી C) પ્રોટીન D) ઉત્સેચકો

299. શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે?
A) વિટામીન - એ B) વિટામીન - ડી
C) વિટામીન - બી-1 D) વિટામીન - સી

300. ....વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે.
A) રેટીનોલ B) કેરોટીન
C) ફોસ્ફરસ D) વિટામીન - ડી

301. રૂધિરને જામી જવાની પ્રક્રિયામાં ....વિટામીન મદદ કરે છે.
A) C B) K C) A D) H

302. વિટામીન - બી-3........નામે ઓળખાય છે.
A) રાઈબોફ્લેવીન B) નાયાસીન
C) ફોલિક એસિડ D) પીરીડોક્સીન

303. વિટામીન - સી ની ઉણપથી ....રોગ થાય છે.
A) સ્કર્વી B) રતાંધળાપણું
C) રિકેટ્સ D) ચીલોસીસ

304. વિટામીન -ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ....છે.
A) સોયાબીન B) પપૈયું
C) માછલીના યકૃતનું તેલ D) લીલાં પાંદડાવાળા શાકભાજી

305. આપણા શરીરમાં રક્તકણોની રચના માટે..........ખૂબ જરૂરી છે.
A) વિટામીન -બી-12 અને ફોલિક એસિડ
B) પ્રોટીન અને પાણી
C) વિટામીન - સી અને ઉત્સેચકો
D) થાયમીન અને રાઈબોફ્લેવીન

306. વિટામીન - બી 3ની ઉણપથી ....રોગ થાય છે.
A) રતાંધળાપણું B) ક્વોશ્યોરકર
C) પેલાગ્રા D) ઓસ્ટીઓમલેશીયા

285)B, 286)C, 287)D, 288)B, 289)D, 290)B, 291)A, 292)B, 293)D, 294)D, 295)B, 296)C, 297)B, 298)A, 299)D, 300)B, 301)B, 302)B, 303)A, 304)C, 305)A, 306)C.

307. જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ............છે.
A) ચોખા B) માછલી C) લોટ D) તેલીબિયા

308. દૂધમાં કયા પોષકતત્વનો અભાવ હોય છે?
A) લોહતત્વ B) ઝીંક C) પ્રોટીન D) કેલ્શિયમ

309. કેલ્શિયમનો ઉત્તમ સ્રોત નીચેનામાંથી કયો છે.
A) મેંદો B) રાગી C) ચોખા D) જવ

310. PFA નું પુરું નામ શું છે?
A) પ્રીવેન્શન ઓફ ફુડએડલ્ટ્રેશન એક્ટ
B) પરમીટેડ ફુડ એડીટીવ્સ એક્ટ
C) પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એક્ટ
D) પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એક્ટ

311. દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ....થી ઓછો હોય.
A) 7 B) 10 C) 6 D) 4

312. મોટા ભાગના બેક્ટેરીયા, યીસ્ટ અને ફૂગની તેજગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે?
A) 25^0 C થી 40^0 C B) 38^0 C થી 45^0 C
C) 16^0 C થી 38^0 C D) 10^0 C થી 40^0 C

313. એરોબીક બેક્ટરીયાના વિકાસ માટે........જરૂરી છે.
A) ઓક્સિજન B) કાર્બન ડાયોક્સાઈડ
C) નાઈટ્રોજન D) સલ્ફર ડાયોક્સાઈડ

314. શીંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમ્યાન..........નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે.
A) માઈક્રોટોક્સીન B) પેનીસીલીયમ
C) આફ્લાટોક્સીન D) એસ્પરજીલસનાઈઝર

315. નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે?
A) ઘઉં B) મસાલા
C) દૂધ D) મિલ્ક પાવડર

316. ફ્રોઝન ફૂડ (હિમશીતીત ખાદ્યપદાર્થ) ને રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે?
A) નિર્જલીકરણ B) પેશ્ચ્યુરાઈઝેશન
C) થોઈંગ (હીમદ્રવણ) D) બોઈલીંગ

317. હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે?
A) તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે.
B) તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે.
C) તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે.
D) તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે.

318. ....પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે.
A) બેક્ટેરીયોસ્ટેટીક B) રાંધણ
C) આથવણ D) બેક્ટેરીસીડલ

319. ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO) ની અંતર્ગત............ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે.
A) માંસ B) ફળો C) અનાજ D) કઠોળ

320. ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે?
A) વધુ પડતી ખાંડ B) પેક્ટીનનો અભાવ
C) વધુ પડતી ગરમી D) ઉપરોક્ત બધા જ

321. એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે?
A) હેમી સેલ્યુલોઝ B) પેક્ટીન
C) સેલ્યુલોઝ D) ડેક્સ્ટ્રોઝ

322. સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ....ના સંપર્કમાં રાખીને સૂકવી શકાય છે.
A) હવા B) પાણી C) પ્રકાશ D) ધુમાડો

323. આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડીન હોવું જોઈએ?
A) 30 ppm B) 15 ppm C) 50 ppm D) 10 ppm

324. બાળકોમાં રતાંધળાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે?
A) વિટામીન - ડી B) વિટામીન - એ
C) વિટામીન - સી D) વિટામીન - કે

325. વિટામીન - ડી ની ઉણપથી .... રોગ થાય છે.
A) સ્કર્વી B) પેલાગ્રા C) રિકેટસ D) ચીલોસીસ

326. અન્નમાર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ....મદદરૂપ થાય છે.
A) શર્કરા B) રેષા
C) એમીનો એસિડ D) ખનીજ ક્ષાર

327. ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં......મહત્વનું છે.
A) ગુંદર B) ગ્લુટામિક એસિડ
C) ગ્લુકોઝ D) ગ્લુટેન

328. આથવણથી........વિટામીનનું પ્રમાણ વધે છે.
A) વિટામીન - કે B) વિટામીન - એ
C) બી સમૂહના વિટામીન D) વિટામીન - ડી

329. દૂધમાં ....શર્કરા કહેલ છે.
A) એમાયલોઝ B) ફ્રૂક્ટોઝ C) લેક્ટોઝ D) સુક્રોઝ

330. મેદસ્વિતા એટલે........
A) અપુરતું પોષણ B) અત્યધિક પોષણ
C) અપુરતુ પોષણ અને અત્યધિક પોષણ
D) ઉપરોક્તમાંથી એક પણ નહી

331. એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને...........કહે છે.
A) આવશ્યક એસિડ B) અનાવશ્યક એસિડ
C) અનાવશ્યક એમિનો એસિડ D) આવશ્યક ફેટી એસિડ

332. ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે?
A) બે B) ત્રણ C) ચાર D) પાંચ

307)B, 308)A, 309)A, 310)A, 311)D, 312)C, 313)A, 314)C, 315)C, 316)C, 317)A, 318)D, 319)B, 320)D, 321)B, 322)D, 323)A, 324)B, 325)C, 326)B, 327)D, 328)C, 329)C, 330)B, 331)D, 332)B.

333. સમતોલ આહાર એટલે.......
A)ફક્ત શકિત પૂરી પાડતો આહાર
B)ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર
C)ફક્ત વૃદ્ધિ-વિકાસ કરતો આહાર
D)ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર

334. ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે?
A)220 B)200 C)280 D)320

335. ભારતમાં રહેતા લોકોની પોષકતત્વની જરૂરિયાત કોના દ્વારા સૂચવાયેલી છે?
A)NIN B)ICMR C)CFTRI D)WHO

336. સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ?
A)2 કિલો B)2.5 કિલો C)3.5 કિલો D)1-2 કિલો

337. કોલસ્ટ્રમ એટલે.......
A)લોહીની નળીમાં જામી જતો પદાર્થ
B)સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી
C)ચરબીયુકત પદાર્થ D)પરિપક્વ

338. ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે.........
A)શરીરમાં પાણીનો ભરાવો થવાથી
B)શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી
C)શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી
D)બાળક જો તંદુરસ્ત હોય તો

339. એનોરેકસીયા નર્વોસા એટલે........
A)વધુ પડતુ ખાવાની ઈચ્છા B)માટી ખાવાની ઈચ્છા
C)વારંવાર ખાવાની ઈચ્છા
D)ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી

340. બુલીમીયા એટલે..........
A)ખૂબ ખાવું અને પછી સૂઈ જવું
B)સ્વૈચ્છિક ભૂખમરો
C)સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી
D)ઉપરોકતમાંથી એક પણ નહી

341. ....ને વિટામીન - એ ની સેવિંગ બેંક કહેવાય છે.
A)કિડની B)હાડકાં C)લીવર D)સ્નાયુ

342. સગર્ભાવસ્થા દરમ્યાન...............ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે.
A)લોહતત્વ B)આયોડીન C)ઝીંક D)વિટામીન-એ

343. મેગાલોબ્લાસ્ટિક એનીમીયા શેની ખામીને લીધે થાય છે?
A)એમીનો એસિડ B)ફોલિક એસિડ
C)એસ્કોર્બિક એસિડ D)કેલ્શિયમ

344. બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
A)ક્ષય B)ઓરી C)પોલીયો D)ટાઈફોઈડ

345. IDD એટલે..........
A)ઈન્ડીવીઝ્યુલ ડેફીસીયન્સી ડીસઓર્ડર
B)આયોડીન ડીસઓર્ડર ડોઝ
C)આયોડીન ડોઝ ડીસ્ટ્રીબ્યુશન
D)આયોડીન ડેફીસીયન્સી ડીસઓર્ડર

346. ઓ.આર.એસ નું પુરું નામ ....
A)ઓરલ રીનલ સોલ્યુશન B)ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન
C)ઓરલ ડેરી સોલ્યુશન D)ઓરલ રીહાઈડ્રેટ સોલ્યુટ

347. ખાદ્ય પરિક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા........ને પદ્ધતિસર અટકાવવાની રીત.
A)ફેરફાર B)બગાડ
C)દેખાવમાં ફેરફાર D)ઉપરોકતમાંથી કોઈ નહી

348. 1 ગ્રામ ચરબી.........કિલો કેલરી શકિત આપે છે.
A)9 કિલો કેલરી B)4 કિલો કેલરી
C)7 કિલો કેલરી D)ઉપરોકતમાંથી કોઈ નહી

349. બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે?
A)સ્વાસ્થય B)પોષણ
C)શિક્ષણ D)ઉપરોક્ત બધા જ

350. પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભાસ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે?
1) લોહતત્વ 2) તાંબું
3) વિટામીન - ઈ 4) ફોલિક એસિડ
A)1, 3, B)2, 4 C)1, 4 D)3, 4

351. આહારમાં ફકત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે?
A)વીગન B)વેજીટેરીયન
C)ફ્રુટેરીયન D)લેકટોવેજીટેરીયન

352. ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે?
A)આહારમાં આયોડીનનો અતિરેક
B)પીટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH)
C)આહારમાં ફલોરિનની ઉણપ
D)આહારમાં સોડિયમનો અતિરેક

353. ભારતમાં આયોડીનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્યપદાર્થમાં આયોડીન ઉમેરવામાં આવે છે?
A)ખાંડ B)મીઠું C)ચોખા D)ઘઉંનો લોટ

354. નીચે પૈકી કઈ જોડી સાચી છે?
1) વિટામીન - એ - એનીમીયા
2) વિટામીન - ડી - સુકતાન
3) વિટામીન - ઈ - રતાંધળાપણું
4) વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા
A)1 B)2 C)3 D)4

333)D, 334)C, 335)B, 336)B, 337)B, 338)A, 339)D, 340)A, 341)C, 342)B, 343)B, 344)A, 345)D, 346)B, 347)B, 348)A, 349)D, 350)C, 351)B, 352)B, 353)B, 354)B.

355. ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.

1) માવો	અ. જીલેટીન
2) કોફી પાવડર	બ. ચીકોરી પાવડર
3) ક્રીમ	ક. સ્ટાર્ચ
4) આઈસ્ક્રીમ	ડ. ઈથાઈલ એસીટેટ

A) 1-ક, 2-બ, 3-અ, 4-ડ B) 1-બ, 2-ડ, 3-ક, 4-અ
C) 1-ક, 2-ડ, 3-બ, 4-અ D) 1 ડ, 2-બ, 3-અ, 4-ક

356. પ્રોટીન કયા તત્ત્વના બનેલાં છે?
A) કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઈટ્રોજન
B) સલ્ફર, કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન
C) લોહતત્ત્વ, કાર્બન, ઓક્સિજન, નાઈટ્રોજન
D) કલોરીન, કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન

357. પ્રોટીનના બંધારણીય ઘટકો ....છે.
A) એમીનો એસિડ B) ફેટી એસિડ C) સેકેરાઈડ D) ખનીજક્ષાર

358. કયું વિટામીન સનસાઈન વિટામીન તરીકે જાણીતું છે?
A) વિટામીન - ડી B) વિટામીન - સી
C) વિટામીન - કે D) વિટામીન - એ

359. નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.

1) વિટામીન - એ	અ. ટોકોફેરોલ
2) વિટામીન - ડી	બ. રેટિનોલ
3) વિટામીન - ઈ	ક. કેલ્સિફેરોલ
4) વિટામીન - બી-1	ડ. થાયમીન

A) 1-અ, 2-ક, 3-બ, 4-ડ B) 1-બ, 2-ક, 3-અ, 4-ડ
C) 1-ડ, 2-બ, 3-ક, 4-અ D) 1-ક, 2-બ, 3-ડ, 4-અ

360. વિટામીન - એ ની ખામીથી થતા રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.
1) અંધાપો 2) રતાંધળાપણું
3) ઝેરોસીસ 4) બીટોટસ્પોટ
A) 2, 4, 3, 1 B) 1, 3, 4, 2 C) 2, 3, 4, 1 D) 1, 2, 3, 4

361. વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે?
A) બેરીબેરી B) પેલાગ્રા C) ડાયેરીયા D) સ્કર્વી

362. વ્યક્તિઓ બી.એમ.આઈ કાઢવા માટે કયા બે પરિણામોની જરૂર પડે છે?
A) વજન અને ઉંચાઈ B) ઉંમર અને ઉંચાઈ
C) વજન અને ઉંમર D) ઉપરોકતમાંથી કોઈ નથી

363. નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો.
1) વિટામીન-એ - રેટીનોલ
2) વિટામીન-ડી - ટોકોટ્રાઈનોલ
3) વિટામીન-બી-12 - સાયેનોકોબાલ અમીન
4) નાયાસિન - નિકોટીનીક એસિડ
A) 1 B) 2 C) 3 D) 4

364. નીચે પૈકી કયા ખાદ્યપદાર્થના પ્રોટીને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે?
A) ઈંડા B) સોયાબીન C) મગફળી D) દૂધ

365. ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે?
A) અનાજ અને કંદમૂળ B) ઘી / તેલ
C) ખાંડ / ગોળ D) ઉપરના બધાજ

366. નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદમાત્રા પોષક ઘટક જૂથનું નથી?
A) કાર્બોદિત પદાર્થ B) પ્રોટીન
C) ચરબી D) ખનીજક્ષાર

367. નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે?
A) શરીરને શકિત પૂરી પાડવી
B) શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી
C) ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય
D) આહારને સ્વાદિષ્ટ બનાવો.

368. બીટા કેરોટીન પોષકતત્વ નીચેનાં પૈકી શામાંથી મળતુ નથી?
A) દૂધ B) લીલાં પાંદડાવાળા શાકભાજી
C) પાકું પપૈયું D) પાકી કેરી

369. ચા, કોફી ....પ્રકારનાં પીણાં છે.
A) તાજગીદાયક B) સ્ફુર્તિદાયક
C) પોષ્ટિક D) ઉપરોકતમાંથી કોઈ નહી

370. સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે.........
A) ડબ્બાબંધ ખાદ્યપદાર્થો B) પડીકાબંધ ખાદ્યપદાર્થો
C) ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો D) ઉપરના તમામ ખાદ્યપદાર્થો

371. કેનીંગ એટલે..........
A) આથો લાવવાની પ્રક્રિયા B) અંકરણની પ્રક્રિયા
C) ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા
D) ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થોનુ સાચવવા

372. નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી?
A) ઉકાળવું B) વરાળ આપવી
C) ઉકળતા પાણીમાં બાફવું D) તળવુ

373. કઠોળને ફણગાવવાના કયા લાભો છે?
A) વિટામીન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
B) ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે
C) ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રીય બને છે.
D) ઉપરના બધા જ લાભો

374. આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે?
A) જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા
B) પ્રદુષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા
C) રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા
D) ઉપરના બધા જ કારણો

375. દુષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી?
A) ઝાડા B) કોલેરા C) ટાઈફોઈડ D) ક્ષય (ટી.બી)

376. ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી?
A) નિર્જલીકરણ B) વરાળથી બાફવું
C) હિમીકરણ D) રાસાયણીક સંરક્ષણ

355)A, 356)A, 357)A, 358)A, 359)B, 360)A, 361)A, 362)A, 363)B, 364)A, 365)D, 366)D, 367)B, 368)A, 369)B, 370)D, 371)C, 372)D, 373)D, 374)D, 375)D, 376)B.

377. એસિડની હાજરીમાં સુક્રોજ (ખાંડ)નું ગ્લુકોઝ અને ફ્રુકટોઝમાં વિઘટન થવાની ક્રિયાને .... કહે છે.
A) ઈન્વર્ટેઝ B) કન્વર્ઝન
C) સ્ફટિકીકરણ D) જળવિભાજન

378. કેકના સુસોભન માટે ....વપરાય છે.
A) આઈસીંગ સુગર B) ખાંડના ચોસલાં
C) દાણાંદાર ખાંડ D) સુગર શીરપ

379. નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્ત્વ છે ?
A) સફેદ તલ B) કાળા તલ C) ખાંડ D) મેંદો

380. પેશ્ચ્યુરાઈઝેશન....
A) નિર્જલીકરણ દૂધ B) ઉકાળેલ દૂધ
C) વપરાશ માટે સલામત બનાવવા નુકશાન કરતા સુક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખૂબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ
D) ઠંડુ કરેલ(ફ્રોઝન) મિલ્ક

381. નીચે પૈકીનું કયું પોષક તત્ત્વ ઈંડામાં હોતું નથી ?
A) વિટામિન - સી B) પ્રોટીન
C) વિટામિન - એ D) કેલ્શિયમ

382. માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયુ પોષકતત્ત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ?
A) પ્રોટીન B) ચરબી
C) કાર્બોદિત પદાર્થ D) લોહતત્ત્વ

383. નીચે પૈકીના ક્યા લક્ષણો વિટામિન-B2 રાઈબોફ્લેવીનની ખામીને લીધે થાય છે ?
A) ચીલોસીસ (હોઠ પર કાપા)
B) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી)
C) એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા)
D) ઉપરોક્ત બધા જ

384. કુપોષણના વિષચક્રમાં નીચેના પૈકી ક્યા પરિબળો ભાગ ભજવે છે?
A) ચેપ B) સંતુલિત ખોરાકનો અભાવ
C) ગરીબી D) ઉપરના બધા જ

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

385. નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે ?
A) લાલ, વાદળી, પીળો B) લાલ, લીલો, જાંબલી
C) પીળો, લીલો, વાદળી D) લાલ, લીલો, વાદળી

386. સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે ?
A) 2 મિનિટના વિલંબથી B) 2 મિનિટ વહેલો
C) 20 મિનિટના વિલંબથી D) 20 મિનિટ વહેલો

387. પ્રણાલિગત રીત અર્થિંગ માટે ક્યા રંગનો વાયર વપરાય છે ?
A) લાલ B) કાળો C) લીલો D) સફેદ

388. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ?
A) સિલ્વર B) ગેલિયમ
C) 22 કેરેટવાળુ સોનું D) 24 કેરેટવાળુ સોનું

389. ફળોના રસ અને જળમાં પરિરક્ષક (પ્રિઝર્વેટિવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ?
A) NH_3 B) SO_2 C) H_2 D) CO_2

390. માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ?
A) 2.2 લીટર B) 5.7 લીટર C) 8.1 લીટર D) 9.3 લીટર

GPSC Class - 2 - 16/04/2017

391. નીચેના પૈકી કયા વિટામીનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે?
A) વિટામીન K B) વિટામીન E
C) વિટામીન D D) વિટામીન C

392. નીચેના પૈકી કયું જોડકુ યોગ્ય નથી?
A) ઈબોલા વાયરસ - શીતળા
B) બાયોમેટ્રીક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ
C) ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ
D) DNA ફિંગરપ્રિન્ટિંગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ

393. ધી પરસેક (The Parsec) એ શાનું એકમ છે?
A) સમય માપવા માટે B) અંતર માપવા માટે
C) ઉર્જા માપવા માટે D) તાપમાન માપવા માટે

394. પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડકટમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે?
A) માટી B) પાણી
C) કાર્બન ડાયોકસાઈડ D) લાકડાનાં વહેર

395. બાયો ગેસ (Bio Gas) નું મુખ્ય ઘટક કયું છે?
A) હાયડ્રોજન B) બ્યુટેન
C) મિથેન D) એસટેલીન/વર્ણહીન રંગહી વાયુ

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

396. આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે?
A) કિડની B) ફેફસા C) હૃદય D) લીવર

397. ફેધમ નીચે પૈકી ક્યા પરિમાણને માપવાનો એકમ છે ?
A) દ્રવ્યમાન B) ઊંચાઈ C) ઊંડાઈ D) દબાણ

398. નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?
A) ડિઝલ એન્જિન - રૂડોલ્ફ ડિઝલ
B) ડાયનામાઈટ-આલ્ફ્રેડ નોબલ
C) ટેલિવિઝન-સેમ્યુઅલ મોર્સ
D) ક્ષ-કિરણો-રોન્ટેજન

377)A, 378)A, 379)B, 380)C, 381)A, 382)C, 383)D, 384)D, 385)D, 386)A, 387)C, 388)C, 389)B, 390)B, 391)A, 392)A, 393)B, 394)C, 395)C, 396)D, 397)C, 398)C.

399. નીચેનામાંથી કયો રોગ બેકટેરિયાથી થતો નથી ?
A)ડિપ્થેરીયા B)પ્લેગ C)કોલેરા D)અછબડા

400. શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે લોહી જામી જવા માટે કયું વિટામીન જરૂરી છે ?
A)વિટામીન-A B)વિટામીન-B
C)વિટામીન-E D)વિટામીન-K

401. H5N1 કયા રોગનો વાયરસ છે ?
A)સ્વાઈન ફ્લુ B)બર્ડ ફ્લુ
C)ચિકનગુનિયા D)ડેંગ્યુ

GPSC આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) - 26/03/2017

402. પોટેશિયમ નાઈટ્રેટ (Potassium Nitrate)નો વધારે ઉપયોગ શામા થાય છે ?
A)દવા બનાવવામાં
B)ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં
C)મીઠાના ઉત્પાદનમાં D)કાચના ઉત્પાદનમાં

403. સોડા વોટરમાં શું રહેલું છે ?
A)કાર્બોનિક એસીડ B)સલ્ફયુરિક એસીડ
C)કાર્બન ડાયોક્સાઈડ D)કાર્બન મોનોક્સાઈડ

404. એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે
A)તેની ભ્રામક અસર છે.
B)ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે.
C)ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે.
D)તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે.

405. સોડીયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે ?
A)પેટ્રોલ B)આલ્કોહોલ C)પાણી D)કેરોસીન

406. વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે?
A)ટંગસ્ટન B)નીચરોમ C)ગ્રેફાઈટ D)લોખંડ

407. 'લાફીંગ ગેસ' એ શું છે ?
A)નાઈટ્રસ ઓક્સાઈડ B)કાર્બન મોનોક્સાઈડ
C)સલ્ફર ડાયોક્સાઈડ D)હાઈડ્રોજન પેરોક્સાઈડ

408. જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ?
A)ઘનીકરણ B)બાષ્પીભવન C)ડીપોઝીશન D)ઉર્ધ્વીકરણ

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

409. પોલીયોની રસીના શોધક કોણ હતા?
A)એડવર્ડ જેનર B)લિયોન
C)જહોન એન્ડર્સ D)જોનલ ઈ.સાલ્ક

410. નીચેના પૈકી કયું સૌથી ઓછુ પ્રદુષણ કરે છે?
A)કોલસો B)ડીઝલ C)કેરોસીન D)હાઈડ્રોજન

411. નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફ્લોરોસન્ટ ટ્યુબમાં વપરાય છે?
A)સોડીયમ ઓક્સાઈડ અને આરગન
B)સોડીયમ વરાળ અને નિયોન
C)મરક્યુરી વરાળ અને આરગન
D)મરક્યુરી ઓક્સાઈડ અને નિયોન

412. રાંધણ ગેસ શેનું મિશ્રણ છે?
A)કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ
B)બ્યુટેન અને પ્રોપેન
C)મિથેન અને ઈથિલિન
D)કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન

413. એક ફેધમ =..............
A)6 ફુટ B)6 મીટર
C)60 ફુટ D)100 સે.મી.

414. માટી એસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી.(JCB) તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે?
A)જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન
B)જોસેફ સિરિલ બામફોર્ડ
C)જહોન ક્રિસ્ટોફર બેક્ષટર
D)જેક કોક્સફોર્ડ બેકર

415. હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી?
A)ડૉ.જહોન સાત્રે B)ડૉ.મારીયા ફિલીપ્સ
C)ડૉ.રોબર્ટ ડાયસ D)ડૉ.પોલ ઝોલ

416. વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે?
A)Low Energy Device B)Light Effective Diode
C)Low Emission Device D)Light Emitting Diode

417. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે?
A)સેકરેટીન B)ઓમેગા C)કેરાટીન D)એન્કીરીન

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

418. સરકો શું છે?
A)પીકરીક એસીડ B)આલ્કોહોલીક એસીડ
C)એસેટીક એસીડ D)ઉપરના પૈકી કોઈ નહીં

419. ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે?
A)બરનૂલીનો સિદ્ધાંત B)પાસ્કલનો સિદ્ધાંત
C)આર્કિમીડીઝનો સિદ્ધાંત D)ઉપરના પૈકી કોઈ નહીં

399)D, 400)D, 401)B, 402)B, 403)C, 404)C, 405)D, 406)A, 407)A, 408)A, 409)D, 410)D, 411)C, 412)B, 413)A, 414)B, 415)D, 416)D, 417)C, 418)C, 419)B.

420. એવો કયો પદાર્થ છે કે જે રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે?
A)હિપારીન B)હિમોગ્લોબિન
C)થાઈરોક્સીન D)પેસપીસ

421. નીચેના પૈકી કયું પરોપજીવી નથી?
A)જૂ B)મચ્છર C)ટિક D)માખી

422. નીચેના પૈકી કયું RDX નું બીજુ નામ છે?
A)સાયકલોનાઈટ B)ડેક્ષટ્રાન
C)સાયનોહાઈડ્રીન D)સાયકલોહેક્ઝાન

423. કૃત્રિમ રેશમને .... પણ કહે છે.
A)ડેકરોન B)રેયોન
C)ફાઈબર ગ્લાસ D)નાયલોન

424. સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે?
A)30^o B)-40^o C)50^o D)60^o

425. નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે?
A)સલ્ફર B)લોખંડ C)કાર્બન D)અમોનિયા

426. કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ"માં કયો વાયુ હોય છે?
A)સોડિયમ એઝાઈડ B)સોડિયમ બાયકાર્બોનેટ
C)સોડિયમ નાઈટ્રાઈટ D)સોડિયમ પેરોક્સાઈડ

427. શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેના પૈકી કયો રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે?
A)ન્યુમોકોનીયોસીસ B)સિલિકોસિસ
C)ક્ષય રોગ D)એન્થ્રાકોસિસ

428. ચૂંટણીમાં મતદારની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે?
A)મિથિલીન બ્લ્યુ B)સીલ્વર નાઈટ્રેટ
C)સોડિયમ પેરાક્સાઈડ D)ફિનોલ્ફથેલીન

GPSC Class - 2 - 18/03/2017

429. સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે?
A)નાયટ્રોજન અને એર્ગોનીયોન B)હાયડ્રોજન
C)કાર્બનડાયોક્સાઈડ D)પ્રાણવાયુ

430. એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે?
A)ગેલીના B)કેલેમાઈન C)કેલ્શાઈટ D)બોકસાઈટ

431. "લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુ સર કરવામાં આવે છે?
A)સમયની ગણત્રી B)અંતરની ગણત્રી
C)પ્રકાશની ગતિની ગણત્રી D)પ્રકાશની તીવ્રતાની ગણત્રી

432. રેડીયમના રેડીયો એકટીવ એલીમેન્ટ ની શોધ કોણે કરેલ હતી?
A)આઈઝેક ન્યુટન B)આલબર્ટ આઈનસ્ટાઈન
C)બેન્જામીન ફ્રેન્કલીન D)મેરી ક્યુરી અને પેરી ક્યુરી

GPSC Class - 1 - 28/01/2017

433. ટેલીવીઝનની શોધ કોણે કરી છે?
A)રોબર્ટ મિલેટ B)માઈકલ ફરોડે
C)જે.એલ.બીર્ડ D)ડૉ.ગેટિંગ

નાયબ ચિટનીશ - 02/06/2015

434. કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ?
A)ઈલેક્ટ્રોન B)પ્રોટોન C)હાઈડ્રોજન D)ન્યૂટ્રોન

નાયબ ચિટનીશ - 05/02/2017

435. 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર ક્યું છે ?
A)C_2H_6 B)C_3H_8 C)C_4H_{10} D)CH_4

GPSC Class - 2 - 16/04/2017

436. વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે?
A)ઘનીભવન B)બાષ્પીભવન C)નિપેક્ષણ D)ઉર્ધ્વીકરણ

437. નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે?
A)કપૂર B)વેનીલા C)ચિકોરી
A)માત્ર 1 અને 2 B)માત્ર 2 અને 3
C)1, 2 અને 3 D)ઉપર પૈકી એક પણ નહી

438. પોલીયોની રસીનાં શોધક કોણ હતા?
A)લુઈસ પાશ્ચર B)જોનાસ સાલ્ક
C)કોનરાડ ઝુસ D)પ્રોટીસ્ટસ

439. નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે?
A)પ્રોટોઝુઆ B)બેક્ટેરીયા C)વાઈરસ D)પ્રોટીસ્ટસ્

GPSC Class - 2 - 02/04/2017

440. રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ?
A)રોબર્ટ વોટ્સન B)ટેલર અને યંગ
C)હેનરી ટેલર D)ઉપર પૈકી એક પણ નહીં

441. કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ?
A)એન્થ્રેસાઈટ B)પીટ C)બિટુમિનસ D)લિગ્નાઈટ

442. નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ?
A)વોટર કલ્ચર B)સેન્ડ કલ્ચર
C)ગ્રેવલ કલ્ચર D)ઉપર્યુક્ત ત્રણેય

420)A, 421)D, 422)A, 423)A, 424)B, 425)A, 426)A, 427)A, 428)B, 429)A, 430)D, 431)B, 432)D, 433)C, 434)D,
435)C, 436)A, 437)C, 438)B, 439)B, 440)B, 441)D, 442)D.

443. નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરીયાથી પેદા થાય છે ?
A) પ્લેગ B) હિપેટાઈટીસ C) ઈન્ફલૂએન્ઝા D) અછબડા

444. કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ?
A) સાઈટ્રિક એસિડ B) એસીટિક એસિડ
C) નાઈટ્રિક એસિડ D) ઓક્ઝેલિક એસિડ

445. ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશના હતા?
A) જર્મની B) ફ્રાંચ C) બ્રિટન D) જાપાન

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

446. સોલરપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે ?
A) ઝીરકોનીયમ B) એલ્યુમિનિયમ
C) ટંગસ્ટન D) સીલીકોન

447. વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ?
A) હાઈડ્રોજન સલ્ફાઈડ B) હાઈડ્રોજન પેરોક્સાઈડ
C) હાઈડ્રોજન નાઈટ્રોઈડ D) હાઈડ્રોજન એક્સાઈડ

448. "નોનસ્ટીક" (Non-Stick) વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ?
A) ટેફલોન B) પી.વી.સી. (PVC)
C) બ્લેક પેઈન્ટ D) પોલીસ્ટ્રીન

449. સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?
A) સાદો અરીસો B) અંતર્ગોળ અરીસો
C) બહિર્ગોળ અરીસો D) પ્લેનો-કોન્વેક્સ અરીસો

450. નીચે દર્શાવેલ તબીબ શાખાઓને તેમનાં સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.

તબીબી શાખા	રોગો
1) ઓનકોલોજી	(અ) યકૃત, સ્વાદુપિંડના રોગો
2) હીમેટોલોજી	(બ) ડાયાબીટીસ, થાઈરોઈડ
3) એન્ડોક્રિનોલોજી	(ક) કેન્સર
4) હીપેટોલોજી	(ડ) લોહીના રોગો

A) 1-ક, 2-અ, 3-બ, 4-ડ B) 1-ક, 2-ડ, 3-બ, 4-અ
C) 1-બ, 2-ડ, 3-અ, 4-ક D) 1-બ, 2-અ, 3-ક, 4-ડ

451. નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.

1) ઝીનોફોબીયા	(અ) ઊંચાઈનો ડર
2) એક્રોફોબીયા	(બ) ઈંજેક્શનનો ડર
3) ટ્રાઈપેનોફોબીયા	(ક) આગનો ડર
4) આર્સનફોબીયા	(ડ) અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર

A) 1-ક, 2-અ, 3-બ, 4-ડ B) 1-ક, 2-બ, 3-અ, 4-ક
C) 1-ડ, 2-અ, 3-બ, 4-ક D) 1-ક, 2-બ, 3-અ, 4-ડ

GPSC Class - 2 - 12/02/2017

452. કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો છે?
A) બિટ્યુમિનસ B) એન્થ્રેસાઈટ
C) લિગ્નાઈટ D) પીટ

453. નીચે દર્શાવેલા વિટામીન્સ પૈકી કયુ વિટામીન રક્ત સ્કંદન (Blood Coagulation) માટે મદદરૂપ છે?
A) વિટામીન એ B) વિટામીન એ તથા બી
C) વિટામીન ડી અને કે D) વિટામીન કે

454. કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે?
A) કપાસનો છોડ B) શેરડીના કૂચા
C) પાપલર ઝાડ D) ઈમારતી લાકડું

455. નીચેનામાંથી સૌથી વધુ લવચીક (elastic) કોણ છે?
A) ગ્લાસ B) સ્ટીલ C) સ્પોન્જ D) રબ્બર

456. બ્રેડ બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે કારણ કે તે .... ઉત્પન્ન કરે છે.
A) બેક્ટેરિયા B) સ્યુગર
C) કાર્બન ડાયોક્સાઈડ D) ઓક્સિજન

457. ટેલીવીઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોનામાંથી બનતા હોય છે?
1) લાલ 2) વાદળી 3) લીલો 4) પીળો
A) 1, 2, 3 અને 4 B) 2, 3 અને 4
C) 1, 2 અને 3 D) 1, 3 અને 4

GPSC Class - 1 - 09/04/2017

458. બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી ?
A) જહોન જે. લીઉડ B) લેવિસ ઈ. વોટરમેન
C) જહોન વોકર D) ઈલ્યિાસ હોવે

459. એટમબોંબના શોધક નીચે પૈકી કોણ છે ?
A) જહોન બ્રાઉનીંગ B) આલ્ફ્રેડ નોબેલ
C) જે. રોબર્ટ ઓપન હૈમર D) પી વોન મૌસર

460. આયોડીનયુક્ત મીઠામાં હોય છે ....
A) પોટેશિયમ આયોડાઈડ B) કેલ્શિયમ આયોડાઈડ
C) મુક્ત આયોડાઈડ D) ઉપર પૈકી એકપણ નહીં

GPSC Class - 2 - 04/03/2017

461. મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?
A) લોહતત્ત્વ B) પ્રોટીન C) વિટામીન D) આયોડિન

462. "Coradia - iiint" કયા દેશ દ્વારા બનાવાયેલ પ્રથમ શૂન્ય ઉત્સર્જન ધરાવતી અને હાઈડ્રોજન ઈંધણ સંચાલિત ટ્રેઈન છે ?
A) ચીન B) યુ.એસ.એ. C) ફ્રાન્સ D) જર્મની

443)A, 444)D, 445)C, 446)D, 447)B, 448)A, 449)B, 450)B, 451)C, 452)B, 453)D, 454)C, 455)A, 456)C, 457)C, 458)A, 459)C, 460)A, 461)B, 462)D.

463. વિદ્યુત ઘડિયાળ (Elecric Clock)ની શોધ નીચેના પૈકી ક્યા વૈજ્ઞાનિકે કરી હતી ?
A) વિલિયમ હાર્વે B) લેવાયસિએ
C) એલેક્ઝાન્ડર બેઈન D) ગોલ્ડસ્ટીન

GPSC Class - 2 - 18/03/2017

464. નીચેનામાંથી ક્યો રોગ વિષાણુથી થતો નથી.
A) હડકવા B) પોલિયો
C) કુષ્ઠરોગ D) ગાલપચોળિયા

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

465. ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, ક્યો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં કરે છે ?
A) ગુરુ B) શુક્ર C) શનિ D) પ્લુટો

466. આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં ક્યો વિકલ્પ સાચો નથી ?
A) ડિસ્ક 12 સેન્ટિમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ.
B) ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ.
C) ડિસ્કનો દરેક ગોબો 500નેનોમીટર પહોળો હોવો જોઈએ.
D) બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ.

467. ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ?
A) વર્ષ 1995, જ્યોતિ બાસુ
B) વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી
C) વર્ષ 1993, સુખરામ
D) વર્ષ 1996, જ્યોતિ બાસુ

468. આપણી સૂર્યમાળાનો ક્યો ગ્રહ વધુ ચન્દ્રો ધરાવે છે ?
A) યુરેનસ B) શનિ C) ગુરુ D) પ્લુટો

469. હીરાની પરખ/જણતરી કેરેટ આધારિત થાય છે, તો એક કેરેટ એટલે કેટલું વજન નિયત થયેલ છે ?
A) 0.1 ગ્રામ B) 0.2 ગ્રામ C) 0.3 ગ્રામ D) 0.4 ગ્રામ

470. વિનેગારનું રાસાયણિક નામ શું છે ?
A) સોડિયમ નાઈટ્રેટ B) ક્લોરાઈડ ઓફ લાઈમ
C) ડાઈલ્યુટ એસિટિક એસિડ D) ઉપરના બધા જ

471. ઈન્જેક્ટ કરી શકાય તેવું ગર્ભનિરોધક શું છે ?
A) ડાયોક્સિમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA)
B) ડાયોક્સિમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA)
C) ડાયાલીસીસ મેધા પ્રેગનન્સી એસેટેટે (DMPA)
D) ડાયોક્સિ મેધા પ્રોગેસ્ટેશન એસેટેટ (DMPA)

GPSC Class - 2 - 5/3/2017

472. સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ?
A) પૃથ્વી B) ગુરૂ
C) શનિ D) નેપચ્યુન (Neptune)

473. બેકીંગ સોડા (Baking soda) એ શું છે ?
A) પોટેશીયમ ક્લોરોઈડ B) પોટેશીયમ કાર્બોનેટ
C) પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ D) સોડીયમ બાયકાર્બોનેટ

474. પિત્તળ હવામાં ક્યા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ?
A) પ્રાણવાયુ B) હાઈડ્રોજન-સલ્ફાઈડ
C) કાર્બન-ડાયોક્સાઈડ D) નાઈટ્રોજન

475. પેન્સીલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ?
A) સીલીકોન B) કોલસો C) સોડીયમ D) ગ્રેફાઈટ

476. "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મુકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ?
A) ટેલીવિઝન B) રેફ્રીઝરેટર
C) ટ્યુબ લાઈટ D) રાંધણ ગેસ

477. બ્રોમીન (Bromine) શું છે ?
A) કાળી માટીનો પ્રકાર છે B) લાલ રંગનું પ્રવાહી છે
C) રંગવગરનો ગેસ છે
D) ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે

478. ધરતી ઉપર સૌથી સખત પદાર્થ ક્યો છે ?
A) સોનુ B) ચાંદી C) હીરો D) પ્લેટીનમ

479. જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઈડ ઉત્પાદન થાય છે ત્યારે
A) ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
B) ખીલીનાં વજનમાં વધારો થાય છે.
C) ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.
D) ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.

480. "ન્યુક્લીયર સાઈઝ" ને ક્યા એકમમાં દર્શાવવામાં આવે છે ?
A) ફેરમી (Fermi) B) એંગસ્ટ્રોમ (Angstorm)
C) ન્યુટન (Newton) D) ટેસલા (Tesla)

GPSC Class - 2 - 11/12/2016

481. CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?
A) ખેતીના પાક વૃદ્ધિ માટે B) પાણીમાંથી ફ્લોરાઈડ દૂર કરવા
C) બાળકોનો ખોરાક બનાવવા D) જમીન ગુણવત્તા સુધારવા

482. નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ?
A) ફેફસા B) કીડની C) લીવર D) ચામડી

463)C, 464)C, 465)B, 466)D, 467)A, 468)C, 469)B, 470)C, 471)A, 472)D, 473)D, 474)B, 475)D, 476)B, 477)B, 478)C, 479)B, 480)A, 481)B, 482)D.

483. LEDમાં સામાન્ય રીતે ક્યા રંગો હોય છે ?
A) અંબર, લાલ, લીલો, ભૂરો B) સફેદ, લાલ, લીલો અને ભૂરો
C) સફેદ, લાલ, લીલો D) અંબર, લાલ, લીલો અને સફેદ

484. 'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
A) જેમ્સ ચેડવીક B) ગોલ્ડી સ્ટીન
C) જે.જે. થોમસન D) જોસેર આસ્પીડીન

485. સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું ક્યું યંત્ર બનાવેલ હતું ?
A) હિપ્સોગ્રાફ B) કેસ્કોગ્રાફ C) મોનોગ્રાફ D) લીફોગ્રાફ

GPSC Class - 2 - 05/02/2017

486. બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે?
A) ગ્રુપ - એ B) ગ્રુપ - બી
C) ગ્રુપ - બી અને ઓ D) ગ્રુપ - બી, એબી અને ઓ

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

487. વિકીરણ-ઉત્સર્જન ની શોધ કોણે કરી હતી?
A) મેડમ ક્યુરી B) હેનરી બેકવેરલ
C) પિઅરી ક્યુરી D) ઉપર પૈકી એકપણ નહી.

488. હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારે જોવા મળશે ?
A) ઈ.સ. 2061-62 B) ઈ.સ.2020-21
C) ઈ.સ.2025-26 D) ઈ.સ.2067-68

489. છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયુ સાધન ઉપયોગમાં લેવાય છે?
A) સાયકાલોમીટર B) સાયકલો ટ્રોન
C) કેસ્કોગ્રાફ D) સાયટો ટ્રોન

490. યકૃતના રોગો કયા વિટામીનની ઉણપથી થાય છે?
A) વિટામીન -ઈ B) વિટામીન-એ
C) વિટામીન-કે D) વિટામીન બી-12

491. સૌર ઉર્જાથી ચાલતું વિમાન " સોલાર ઈમ્પલ્સ" કયા દેશમાં બનેલું છે?
A) યુ.એસ.એ B) ફ્રાન્સ C) કેનેડા D) સ્વિટ્ઝર્લેન્ડ

492. શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે?
A) સફેદ રક્તકણો B) લાલ રક્તકણો
C) સફેદ અને લાલ રક્તકણો
D) સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

493. કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે ક્યો મેટલ છે ?
A) ટાઈટેનિયમ B) ઝિર્કોનિયમ C) પ્લુટોનિયમ D) રેડીયમ

494. હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ?
A) 66 વર્ષ B) 70 વર્ષ C) 72 વર્ષ D) 76 વર્ષ

495. વીજપ્રવાહનો SI એકમ ક્યો છે ?
A) વોલ્ટ B) એમ્પીયર C) કલોમ્બ D) જોઉલ્સ

496. એન્ટિબાયોટિક પેનિસિલિનની શોધ કોણે કરી ?
A) લુઈ પાશ્વર B) રોબર્ટ કોચ
C) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ D) એસ.વાક્સમાન

497. ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ?
A) યકૃતનો B) હૃદયનો C) ફેફસાનો D) આંતરડાનો

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

498. વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ?
A) 73 B) 75 C) 78 D) 71

499. ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી ક્યા દેશના હતા?
A) સ્વીડન B) નોર્વે C) સ્પેન D) ઈન્ડોનેશિયા

500. વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રીક ટન કાર્બન છોડે છે ?
A) 4.1 B) 4.5 C) 4.9 D) 3.8

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

501. 1 ઘનમીટર = ...
A) 1 કિલો લીટર B) 1 મીલી લીટર
C) 100 મીલી લીટર D) 100 કિલો લીટર

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

502. ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ?
A) સોડિયમ બાયકાર્બોનેટ B) સોડિયમ કાર્બોનેટ
C) સોડિયમ ક્લોરાઈડ D) એકેય નહીં

503. યુરિયા ક્યા પ્રકારનું ખાતર ગણાય ?
A) ફોસ્ફેટીક ખાતર B) નાઈટ્રોજીનસ ખાતર
C) પોટાશીક ખાતર D) એકેય નહીં

504. મૂળ કાપી ખાનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે ?
A) મેલાથીઓમ B) કલોરો પાયરી ફોસ
C) ડાયમીથોએટ D) એકેય નહીં

483)A, 484)A, 485)B, 486)C, 487)B, 488)A, 489)C, 490)C, 491)D, 492)B, 493)A, 494)D, 495)B, 496)C, 497)C, 498)C, 499)A, 500)B, 501)A, 502)A, 503)B, 504)B.

505. ઈલેક્ટ્રોનિક ચોક બોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે ?
A) LCD પ્રોજેક્ટર B) OHP પ્રોજેક્ટર
C) VHS પ્રોજેક્ટર D) બેટા ક્રોમ પ્રોજેક્ટર

506. ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
A) ડાંગરની ક્યારીઓ B) શેરડીના ખેતરો
C) ઘઉંના ખેતરો D) ફળ બગીચાઓ

507. છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ?
A) ક્લોરોફિલ B) ઝેન્થોફિલ
C) કેરોટીનોઈડ્સ D) સાયકોકેનાઈન

508. ઓઝોન લેયરને નુકસાન કરતું પરિબળ કયું છે ?
A) કાર્બનના ઓક્સાઈડ્સ B) નાઈટ્રોજનના ઓક્સાઈડ્સ
C) સલ્ફરના ઓક્સાઈડ્સ D) આમાંથી કોઈ નહીં

509. પીવાના પાણીમાં લોહતત્ત્વની ક્ષમ્યમાત્રા કેટલી હોવી જોઈએ ?
A) 1.0 પી.પી.એમ. B) 1.5 પી.પી.એમ.
C) 2.0 પી.પી.એમ. D) 2.5 પી.પી.એમ.

510. મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે ?
A) એપીકલ્ચર B) ઈરીકલ્ચર C) શેરીકલ્ચર D) ટીસ્યુકલ્ચર

GSSSB મિકેનિક - 2017

511. દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?
A) પૃષ્ઠતાણ B) કેશાકર્ષણ
C) દબનીયતા D) પ્રવાહીને કદ હોય છે.

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

512. "સાપેક્ષવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.
A) ન્યૂટન B) આઈન્સ્ટાઈન C) કેપ્લર D) હબલ

513. વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ?
A) સીસુ B) કાર્બન મોનોક્સાઈડ
C) કણયુક્ત કચરો D) અમોનિયા

514. શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ?
A) સુવાહક B) અવાહક C) અર્ધવાહક D) અતિવાહક

515. Which is the best conductor of electricity ?
A) Silver B) Iron C) Copper D) Carbon

516. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?
A) કલોરિન B) નાઈટ્રોજન C) હાઈડ્રોજન D) ઓક્સિજન

517. એલ્યુમિનાનું રાસાયનિક સૂત્ર કયું છે ?
A) Al_2O_3 B) $Al_2O_32H_2O$
C) $Al_2O_3H_2O$ D) $NaAlO_2$

GSSSB સર્વેયર - 2016-17

518. કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહિટના માપક્રમ સરખા હોય છે ?
A) 23 B) -20 C) - 40 D) 40

519. ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ?
A) ક્લોરીન B) એમોનિયા
C) ક્લોરોહેકઝા મિથેન D) મિથાઈલ આઈસોસાયનેટ

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

520. દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે?
A) આલ્બુમિન B) લેક્ટોઝ C) કેસીન D) ગ્લોબુલિન

521. વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચે પૈકી કયું છે?
A) ઉકાળીને ગાળેલું ગરમ પાણી
B) નિસ્યંદિત પાણી (Distilled Water)
C) રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી
D) મીઠાવાળું પાણી (Salt Water)

522. ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટેના નીચે આપેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે?
A) ખગોળીય એકમ (Astronomical Unit)
B) પ્રકાશવર્ષ
C) પેરોલેક્સ સેકન્ડ D) ઉપર પૈકી એક પણ નહી

મુખ્ય સેવિકા - 8/1/2017

523. કંઠમાળ(ગોઈટર)કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?
A) આયોડીન B) લોહતત્ત્વ
C) પ્રોટીન D) વિટામીન - B1

524. બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ.સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ?
A) ઝીંક B) પોટેશિયમ C) કેલ્શિયમ D) આયોડિન

525. કયા વિટામિન ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે ?
A) વિટામિન - એ B) વિટામિન - ડી
C) વિટામિન - સી D) વિટામિન - કે

526. મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ?
A) ક્લોરોક્વીન B) ક્લોરીન
C) કોટ્રીમોક્ષાઝોલ D) ડીસ્પ્રીન

527. બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ?
A) બીસીજી B) ત્રિગુણી C) ઓરી D) પેન્ટાવેલન્ટ

528. શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે ?
A) 7 B) 14 C) 8.5 D) 7.4

505)B, 506)A, 507)C, 508)B, 509)A, 510)A, 511)B, 512)B, 513)D, 514)B, 515)A, 516)C, 517)A, 518)C, 519)D, 520)C, 521)D, 522)A, 523)A, 524)A, 525)C, 526)A, 527)C, 528)A.

529. દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ?
A) વ્યક્તિના વજન B) વ્યક્તિની ઊંચાઈ
C) વ્યક્તિનું કામ D) આબોહવા

530. નખ શેના બનેલા હોય છે ?
A) પ્રોટીન B) કેરોટીન
C) આયર્ન D) હિમોગ્લોબિન

531. વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ?
A) સ્ટ્રેટોસ્ફિયર B) ટ્રોપોસ્ફિયર
C) આયનોસ્ફિયર D) મેસોસ્ફિયર

532. માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?
A) ઓટોપ્સી B) એનાટોમી C) ઓટોસેજન D) ઓટોગ્રાફ

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

533. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને...........કહે છે.
A) ઘનફળ B) ઘનતા C) ક્ષેત્રફળ D) દ્રવ્ય

534. પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે?
A) બ્યુરેટ B) ત્રાજવા C) વજનિયા D) સ્પ્રિંગ કાંટો

535. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે?
A) અંતર્ગોળ B) બહિર્ગોળ C) ખરબચડા D) સપાટ

536. પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ....છે.
A) મીલીગ્રામ B) કિલોગ્રામ C) ટન D) ગ્રામ

537. ગ્રાહકસુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ?
A) ઈ.સ. 1989 B) ઈ.સ. 1981 C) ઈ.સ. 1986 D) ઈ.સ. 1984

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

538. સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ?
A) ફોટોસ્ફિયર B) કોરોના C) ક્રોમોસ્ફિયર D) સૂર્યકલંકો

539. મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો.
A) Cu + Zn B) Cu + Ni C) Cu + Sn D) Cu + Fe

540. જનીન બેંકનો ઉપયોગ માણસે નીચેનામાંથી શાના માટે કર્યો ?
A) ખેતીવાડી B) પશુપાલન
C) મત્સ્ય ઉદ્યોગ D) A, B અને C ત્રણેય

541. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો .
A) પૂર્વજન્યાવર્તનવાદ 1) ચરક
B) ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીનવિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતા 2) અર્ન્સ્ટ હકલ
C) 'અચળ તાપમાને નિશ્ચિત દળનાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે.' 3) રોબર્ટ હૂક
D) સ્થિતિસ્થાપકતા અને વિરુપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ 4) રોબર્ટ બાઈલ
A) a-1, b-3, d-4 c-2 B) c-4, a-2, b-3, d-1
C) d-3, a-2, b-1, c-4 D) b-2, d-3, c-4, a-1

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

542. -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ?
A) -2.5 D B) 2.5 D C) -4.0 D D) +4.0

543. કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ?
A) પેપસ્મિયર B) એલિઝાટેસ્ટ
C) વેસ્ટર્ન બ્લોટ D) વિડાલ કસોટી

544. બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ?
A) શૂન્ય B) બે C) ત્રણ D) આઠ

545. લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુકસાનકારક પદાર્થ છૂટો પડે છે ?
A) નાઈટ્રોજન B) ઓક્સિજન
C) કાર્બન ડાયોક્સાઈડ D) હાઈડ્રોકાર્બન

546. પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે?
A) પાણી B) કાચ C) હીરો D) એકપણ નહી

GSSSB હેડ કલાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

547. નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?
A) વિનેગરમાં B) લીંબુમાં C) નારંગીમાં D) આમલીમાં

548. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ?
A) બૃહદમસ્તિષ્ક B) લંબમજ્જા
C) અનુમસ્તિષ્ક D) સેતુ

549. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ?
A) C_nH_{2n+2} B) C_nH_{2n} C) C_nH_{2n-2} D) C_nH_n

550. એસિટોનનું IUPAC નામ શું છે ?
A) પ્રોપેનાલ B) પ્રોપેનીન
C) પ્રોપેનોઈક એસિડ D) પ્રોપેનોલ

551. યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે ?
A) ન્યુમોનિયા B) મેલેરિયા C) શરદી D) ટાઈફોઈડ

552. તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો.
A) Cu > Hg > Ag > Au B) Ag > Hg > Au > Cu
C) Hg > Ag > Cu > Au D) Cu > Ag > Au > Hg

553. ઈલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
A) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર
B) યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
C) વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર
D) વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર

554. મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?
A) શોષણ B) પરાવર્તન C) વક્રીભવન D) વિભાજન

529)A, 530)B, 531)B, 532)A, 533)B, 534)D, 535)B, 536)B, 537)C, 538)B, 539)A, 540)D, 541)C, 542)C, 543)D, 544)A, 545)C, 546)C, 547)D, 548)B, 549)B, 550)B, 551)D, 552)A, 553)B, 554)A.

TET-II -2017

555. સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચલણને શું કહેવાય છે ? - **ફોટોનેસ્ટી**

556. માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકીંગ ઉપર કયા રંગની નિશાની હોય છે ? - **લાલ**

HTAT - 2014

557. ઈબોલા રોગ શેનાથી ફેલાય ? : **વાઈરસ**

558. શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા-જુદા રંગોની વિવિધતા આવે છે? : **ક્રોમોપ્લાસ્ટ**

એકાઉન્ટ એન્ડ ઓડિટર - 2016

559. સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખુ કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? - **ફટકડી (એલમ)**

560. દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ? - **કેલ્શિયમ ફોસ્ફેટ**

કોમર્શિયલ ટેક્સ ઈન્સ્પેક્ટર પેપર - 1

561. જે અણુ સબમરીનનું નામ આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી છે ? - **રશિયા**

562. એક કિલોગ્રામ CNGના દહનથી આશરે કેટલા કિલોજુલ ઉષ્મઊર્જા પ્રાપ્ત થાય છે ? - **55000**

563. કાર્બનનું કયું સ્વરૂપ ફૂટબોલ કાર્બન તરીકે પણ ઓળખાય છે ? - **ફુલેરિન્સ**

564. કયા સ્થળે પડેલા 15 પાઉન્ડના ખડકોના ટુકડા મંગળ ગ્રહના હોવાનું મનાય છે ? - **મોરોક્કો**

565. હાઈડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર આધારિત છે ? - **અણુઓના જોડાણની પ્રક્રિયાનો સિદ્ધાંત**

પોલીસ કોન્સ્ટેબલ - 2012

566. સુનામી શાના કારણે ઉદ્ભવે છે? - **દરિયામાં ધરતીકંપથી**

567. પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? - **ઓકિસજન અને હાઈડ્રોજન**

568. હૃદય કયા તંત્રનો ભાગ છે? - **રૂધિરાભિસરણતંત્ર**

569. બોકસાઈટમાંથી કઈ ધાતુ મળે છે ? - **એલ્યુમિનિયમ**

570. લિગ્નાઈટનો ઉપયોગ શાના માટે થાય છે? - **વીજળી ઉત્પન્ન કરવા માટે**

571. પાણીમાં મીઠું ઉમેરવાથી તેનુ ઉત્કલન બિંદુ - **ઉપર જાય છે**

572. ઈલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? - **ટંગસ્ટન**

573. જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? - **પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના બળ કરતાં વધુ છે**

574. પ્રેસર કુકરમાં રસોઈ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે - **દબાણ વધતાં ઉત્કલન બિંદુ વધે છે**

575. ટેલિફોનના શોધક કોણ હતાં ? - **ગ્રેહામ બેલ**

576. ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો? - **ન્યુટન**

577. ઉદર પટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? - **શ્વનસક્રિયા**

578. સૂર્ય - **એક તારો છે**

579. રતાંધળાપણું અટકાવવા દર્દીને કયુ વિટામીન આપવું જોઈએ ? - **એ**

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

580. ભારત સરકારની નવી નીતિ અનુસાર પેટ્રોલમાં શેનું મિશ્રણ કરવામાં આવે છે ? - **ઈથેનોલ**

581. ધરતીકંપની તીવ્રતા માપતા સાધનને શું કહે છે ? - **સીસ્મોગ્રાફ**

582. પદાર્થોને પોતાની તરફ ખેંચવાના પૃથ્વીના બળને શું કહે છે ? - **ગુરુત્વાકર્ષણ**

583. શાહીચૂસ કાગળમાં શાહી ચૂસવાની પ્રક્રિયા કયા કારણે થાય છે? - **કેશાકર્ષણ**

584. છોડ દ્વારા પોતાના માટે ભોજન બનાવવાની પ્રક્રિયાને વનસ્પતિશાસ્ત્રની ભાષામાં શું કહેવાય છે ? - **પ્રકાશ સંશ્લેષણ**

585. માનવશરીરનો મૂળભૂત એકમ કયો છે ? - **કોષ**

GSSSB જૂનિયર આસિસ્ટન્ટ - 2017

586. કોલસાનુ પરિપક્વ સ્વરૂપ કયું છે? - **એન્થ્રેસાઈટ**

587. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં રચાય છે? - **નેત્રપટલ પર**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

588. અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? - **ન્યુલેન્ડ**

589. લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયુ વિટામીન મળે છે ? - **સી**

590. વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયુ યંત્ર વપરાશે ? - **ગેલ્વેનોમીટર**

591. કેલ્શિયમ ઓકસાઈડ એટલે શું ? - **કળી ચૂનો**

592. શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? - **એનાટોમી**

593. કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી? - **કેસ્કોગ્રાફ**

594. પ્રકાશવર્ષ શાનો એકમ છે ? - **અંતર**

595. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? - **બુધ**

596. શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? - **એડવર્ડ જેનર**

597. ભારતે સૌપ્રથમ વખત અણુધડાકો કયા કર્યો હતો ? - **પોખરણ**

598. ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? - **કેન્સર**

599. સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને ક્યું વિટામિન પ્રાપ્ત થાય છે ? - **D**

600. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? - **ઈ.સ.1986**

601. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ? - **બોક્સાઈટ**

602. દારૂના વધુ પડતા સેવનથી શરીરના ક્યા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ? - **લીવર**

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

603. સ્વાઈન ફ્લુ મહામારીની શરૂઆત વર્ષ 2009માં સૌપ્રથમ ક્યા થઈ હતી ? - **મેક્સિકો**

604. તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? - **37^0**

605. શરીરમાં શાની ઉણપથીં ડાયાબિટીસ થાય છે ? - **ઈન્સ્યુલિન**

606. શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ) શા માટે જાણીતું છે ? - **ઉપગ્રહ છોડવા માટે**

607. સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા વપરાય છે ? - **લોહીનું દબાણ**

મહેસૂલી તલાટી - 2014

608. અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું ક્યું અંગ અસર પામે છે ? - **મગજ**

609. ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? - **રૂડોલ્ફ**

610. ધાતુઓ ઓગાળવા માટે કઈ ખનીજનો ઉપયોગ થાય છે ? - **ફલોરસ્પાર**

TET- II - ભાષા - 2014

611. હવામાં રહેલા ઘટકોમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે ? - **નાઈટ્રોજન**

TET- II - ભાષા - 2015

612. જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે? - **ડો.હરગોવિંદ ખુરાના**

TET- II - ગણિત-વિજ્ઞાન - 2015

613. હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે ? - **બેરોમીટર**

614. દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? - **ઉભયજીવી**

615. જો પદાર્થ પર લાગતા બળ અને તેના સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 હોય, તો આ બળ વડે થતું કાર્ય? - **મહત્તમ હશે**

616. એમોનિયાની બનાવટમાં ક્યો ઉદ્દીપક વપરાય છે ? - **Fe_3O_4**

617. ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા (reflex action) કરાવનાર અવયવ ક્યો ? - **કરોડરજ્જુ**

618. ગોઈટર નામનો રોગ ક્યા અંતઃસ્રાવની ઉણપથી થાય છે ? - **થાયરોક્સિન**

619. કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃ સર્જનથી પ્રજનન થાય છે? - **પ્લેનેરિયા**

620. મગજના તળિયે કઈ અંતઃ સ્રાવી ગ્રંથિ આવેલી છે ? - **પિચ્યુટરી ગ્રંથિ**

621. ઈલેક્ટ્રીક સગડી, થર્મોસ, સોલાર હોટર હીટર વગેરેમાં ક્યા ગ્લાસનો ઉપયોગ થાય છે ? - **ગ્લાસવુલ**

622. હોકાયંત્રમાં ક્યા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? - **સોયાકાર ચુંબક**

623. પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછુ ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? - **જળચક્ર**

624. પારો કઈ રીતે ગરમ થાય છે ? - **ઉષ્માવહન**

625. જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ક્યા વિટામિનની જરૂરિયાત રહે છે ? - **વિટામીન- બી**

626. નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષણ કરે છે ? - **રિબોઝોમ**

627. રુધિરમાં ક્યા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ? - **રક્ત કણો**

628. કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? - **સોડિયમ**

629. પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? - **જ્વલન બિંદુ**

જૂનિયર કલાર્ક પેપર - 1 - 2012

630. કિમોથેરાપી ક્યા રોગની સારવારમાં કરાય છે ? - **કેન્સર**

631. જીભ આવી હોય તો ક્યું વિટામિન લેવું પડે ? - **વિટામિન 'B' કોમ્પ્લેક્સ**

632. ગ્લુકોમા માનવ શરીરના ક્યા અંગને લગતો રોગ છે ? - **આંખ**

633. ઓક્ટોપસને કેટલાં હાડકાં હોય છે ? - **શૂન્ય**

634. અંધજનો માટે વાંચવાની લિપિ ની શોધ ક્યા વર્ષમાં થઈ હતી ? - **1824-25**

635. અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે ? - **ઝીંક ફોસ્ફાઈડ**

636. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલાં વર્ષ છે ? - **76**

નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી - 2011

637. ઓપ્ટિકલ ફાઈબર કેબલ શાના માટે વપરાય છે ? - **સંદેશાવ્યવહાર**

638. એપોજીએ એવી સ્થિતિ છે કે… - **કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય**

639. નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? - ઉડોમીટર

640. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? - **અવાજની ગતિ**

641. નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશ કરે ત્યારે - **તે થોડું ઉંચકાય છે**

642. પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિમિનિટે કેટલી વાર ધબકે છે ? - **72**

643. કઈ નિદાન પધ્ધતિમાં વિકિરણ (રેડિયેશન) થતું નથી ? - **એન્ડોસ્કોપી**

644. તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે ? - **સલ્ફર ડાયોકસાઈડ**

645. વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? - **વૃક્ષનાં થડમાં પ્રડેલ વર્તુળાકાર વલયોથી** .

646. સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે ? - **રેતી**

નાયબ મામલતદાર/DY.S.o - 2012

647. પરીક્ષણ કરાયેલ બ્રહ્મોસ મિસાઈલ સંબંધે કઈ બાબત સાચી છે? - **ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મસ્કોવા નદીનાં નામ જોડી બ્રહ્મોસ નામ અપાયું છે**

648. નિશાન્તએ શું છે? - **માનવરહિત એરિયલ વ્હીકલ**

649. સોનું, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સૌથી સખત ધાતુ કઈ છે? - **ટંગસ્ટન**

650. રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે? - **ક્યુરી**

651. પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? - **ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું**

652. પિયુષ (પિચ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ - **બાળકની ઉંચાઈ ખૂબ વધારે છે**

653. મિટિરિયોલોજી શાસ્ત્રએ - **હવામાનનાં લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે**

654. કાર્તેઝીય ડ્રાઈવર કયાં સિધ્ધાંત પર કાર્ય કરે છે? - **તરતા પદાર્થનો સિધ્ધાંત**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

655. ક્યા સજીવકની ઉણપથી વાંઝિયાપણું ઉદ્ભવી શકે છે ? - **ઈ**

656. ક્યો ગ્રહ બીજા ગ્રહો કરતાં 'ઊંધી દિશામાં ધરીભ્રમણ' કરે છે ? - **શુક્ર**

657. ક્યા મચ્છરો હાથીપગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે ? - **ક્યુલેક્સ ફટિગન્સ (Culex Fatigue)**

658. ભૌતિક વિજ્ઞાનમાં સમગ્રતયા વિદ્યુત તટસ્થ વર્તણૂંક ધરાવતા તથા સૂર્યના તાપમાને અસ્તિત્વ ધરાવતા ધન અને ઋણ વિજભાર ધરાવતા તથા તટસ્થ કણોના સમૂહને શું કહેવામાં આવે છે ? - **પ્લાઝમા**

659. કઈ માછલીઓમાં નર ઈંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે ? - **બિડાલમીન**

660. બેક્ટેરિયાનો નાશ ક્યો વાયુ કરે છે ? - **ક્લોરિન**

661. લાઈ ડિટેક્ટર (Lie Detector)નું ટેક્નીકલ નામ શું છે ? - **પોલીગ્રાફ**

662. ડિસેમ્બર-2014માં ભારતે ક્યા દેશને યુદ્ધપોત (સબમરીન) વેચી વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો ? - **મોરીશ્યસ**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

663. ઈસરો (ISRO) દ્વારા તાજેતરમાં છોડાયેલ મંગલયાન પૃથ્વી ઉપરથી ક્યા દિવસે લોન્ચ કરવામાં આવ્યું ? - **5 નવેમ્બર, 2013**

સચિવાલય સિનિયર ક્લાર્ક - 2016

664. ક્યા એસિડને 'રસાયણોનો રાજા' કહેવામાં આવે છે ? - **સલ્ફ્યુરિક એસિડ**

665. ઈલેક્ટ્રિક જનરેટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? - **યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર**

666. કુદરતી વાયુમાં ક્યો હાઈડ્રોકાર્બન મુખ્ય છે ? - **મિથેન**

667. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે ? - **4**

668. ક્યું અધાતું તત્ત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ? - **બ્રોમિન**

669. ચુંબકીય ક્ષેત્રની હાજરી ક્યા સાધન વડે જાણી શકાય છે ? - **ચુંબકીય સોય**

TET- I - 2012/2014

670. નખ શાના બનેલા હોય છે ? - કેરોટિન

671. પૃથ્વીની સપાટીથી લગભગ 15 થી 50 કિ.મી. ઊંચાઈ સુધી ક્યા વાયુનો થર આવેલો છે ? તે સૂર્યના ક્યા રંગના કિરણોનું શોષણ કરે છે ? - **ઓઝોન વાયુ, પાર જાંબલી રંગના**

672. સાબુનું દ્રાવણ કોની સાથે લાલ રંગ આપે છે - હળદર

673. માનવ શરીરનું ક્યું અંગ માત્ર કૂર્ચાનું બનેલું છે ? - નાક

સબ ઓડિટર - 2015

674. પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઊર્જા સ્રોત શું છે ? - **સૂર્ય**

675. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા ? - **રાકેશ શર્મા**

સબરજિસ્ટ્રાર - 2013

676. મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે ? - **હૃદયને સ્થાન આપવાની વ્યવસ્થા છે**

677. મંગળ પર જીવનની શોધ માટે ''નાસા'' દ્વારા અવકાશમાં મોકલેલ યાનનું નામ શું છે ? - **ક્યુરીયોસીટી**

678. ક્યા જીવાણુંને લીધે દુધમાંથી દહીં બને છે ? - **લેક્ટોલેસીસ**

679. પુખ્ત વ્યક્તિમાં રૂધિરનું પ્રમાણ (જથ્થો) કેટલું હોય છે ? - **5 થી 6 લીટર**

680. કઈ ગ્રંથિ હાડકાં અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે ? - **પીટ્યુટરી ગ્રંથિ**

681. યુગ્મ જોડો - **કમળો : યકૃત, મલેરિયા : બરોળ, ટાઈફોઈડ : આંતરડા**

TAT - 2012

682. રિક્ટર સ્કેલ.........ની તીવ્રતા માપવાનો એકમ છે? - **ધરતીકંપ**

683. માનવ શરીરના કોષોમાં કયો આનુવંશિક પદાર્થ જોવા મળે છે? - **ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ**

684. કેન્સર શું છે? - **શરીરના એક ભાગમાં અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ**

HTAT - 2012

685. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ - **તેઓ મિસાઈલ મેન તરીકે વિખ્યાત છે**

686. બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે?- **ખગોળશાસ્ત્ર**

687. હવાના ઘટકો કદ પ્રમાણે ટકાવારીમાં ઉતરતા ક્રમે છે? - **નાઈટ્રોજન, ઓકિસજન, કાર્બન ડાયોક્સાઈડ**

688. હથોડી, એરણ, પેંગડુ શરીરમાં ક્યાં આવેલું છે?- **કાનમાં**

689. બૂટપોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? - **લેમ્પ બ્લેક**

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ - 2016

690. કોને વનસ્પતિનું રસોડું કહે છે? - **પર્ણ**

691. કયા વાયુ વિના આપણે ન જીવી શકીએ છીએ. - **ઓકિસજન**

PSI - 2012

692. નેત્ર દાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ? - **કોર્નિયા**

693. ડી.એન.એ.(DNA)ને આમાંથી કોની સાથે સંબંધ છે ? - **વંશ**

694. નીચેનામાંથી કયું વિટામીન લોહી જામી જવા માટે જરૂરી છે ? - **વિટામીન - K**

695. યાંત્રિક ઊર્જામાં રૂપાંતર સાધન કયું છે ? - **ડાયનામો**

696. સુપરસોનિક એટલે શું ? - **અવાજથી વધારે ઝડપ**

697. દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું ? - **અલબર્ટ આઈસ્ટાઈન**

698. ભારતના સર્વપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે ? - **મહેસાણા**

699. અંતરિક્ષ યાત્રી સુશ્રી સુનિતા વિલિયમ્સ બીજી અંતરિક્ષ યાત્રા માટે કયા દેશથી ઉડાન ભરી છે ? - **કજાકસ્તાન**

700. વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલ કયુ પ્રકલ્પિત પાર્ટિકલને ગોડ પાર્ટિકલ ના નામથી જાણવામા આવે છે ? - **હિગ્સ-બોસોન**

701. હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ? - **બેરોમીટર**

702. PNGનું પૂરૂ નામ શું છે ? - **પાઈપ્ડ નેચરલ ગેસ**

703. ઓપ્થેલમોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે ? - **આંખ**

704. ભારતીય રિસર્ચ સ્ટેશન હીમાદ્રી કયા આવેલું છે ? - **આર્કટીક**

705. સોનાનો રાસાયણિક પ્રતિક કયો છે ? - **Au**

706. ઈન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે ? - **સ્વાદુપિંડ**

707. LEDનું નામ છે ? - **Light Emitting Diode**

708. કમ્યુનિકેશન ઉપકરણોમાં બ્લ્યુટૂથના શું હેતુ છે ? - **ટૂંકા અંતર પર માહિતી આપ-લે માટે વાયરલેસ ટેકનોલોજી માનક**

PSI નશાબંધી - 2011

709. એલપીજી એટલે શું ? - **લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ**

710. પરમાણુ ક્રમાંક કોને કહે છે ? - **પરમાણુમાં રહેલા ઈલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને**

એકાઉન્ટ ઓફિસર - 1999

711. કાર્બન ડાયોક્સાઈડનું અણુસૂત્ર થાય - **CO_2**

712. ભારતે અણુધડાકા કયા કર્યા હતા ? - **પોખરણ**

713. હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે ? - **હિલિયમ**

714. ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો ? - **DDT**

715. સ્ફોટક પદાર્થ બનાવવામાં શેનો ઉપયોગ થાય ? - **પોટેશિયમ નાઈટ્રેટ**

716. ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો ? - **ઉત્ક્રાંતિવાદ**

717. પ્રકાશનું ઉદ્ગમ સ્થાન શું છે ? - **સૂર્ય**

718. માછલીના શ્વસન અંગને શું કહેવાય ? - **ચૂઈ**

719. પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિ.મી. ઊંચાઈ સુધી પથરાયેલ હોય ? - **1000 કિ.મી.**

720. વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય ? - **હાઈગ્રોમીટર**

721. સોડિયમની સંજ્ઞા કઈ છે ? - **Na**

722. હોકાયંત્રથી કઈ બાબતની માહિતી મળે ? - **દિશાઓની**

723. સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા શું વપરાય ? - **યીસ્ટ**

724. સૂર્યકૂકરમાં કયા પ્રકારની ઊર્જા વપરાય ? - **પ્રકાશ ઊર્જા**

725. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે? - **કાર્બન ડાયોક્સાઈડ**

726. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામીન ? - **વિટામીન-સી**

આંકડાકીય અધિકારી - 2000

727. માનવ શરીરમાં લોહીની શુદ્ધિ ક્યા અંગ દ્વારા થાય છે ? - **કીડની**
728. વિટામીન સીની અછતના કારણે ક્યો રોગ થાય છે ? : **સ્કર્વી**
729. ઈન્સ્યુલિનની ખામીને કારણે ક્યો રોગ થાય ? - **મધુપ્રમેહ (ડાયાબિટસીસ)**
730. ધરતીકંપ અને તેની તીવ્રતા માપવા ક્યું સાધન વપરાય ? - **સિસ્મોગ્રાફ**
731. ડેસિબલ એકમનો ઉપયોગ શું માપવા થાય ? - **અવાજ**

ચીફ ઓફિસર - 1999

732. ગુરુત્વાકર્ષણના નિયમ સાથેક્યા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? - **ન્યૂટન**
733. આંખની દ્રષ્ટિશક્તિ માટે ક્યું પોષક વિટામીન ગણાય ? - **એ**
734. પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે ? - **જીવશાસ્ત્ર**
735. અવકાશના સંદેશા ઝીલવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? - **રડાર**
736. આકાશ ભૂરું દેખાવાનું કારણ શું છે ? - **પ્રકાશનું વક્રીભવન**
737. નીચેનામાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ જાણીતું હતું ? - **પ્રફુલચંદ્ર રોય**

મેડિકલ ટ્યૂટર - 2000

738. માનવ શરીરનો મૂળભૂત એકમ ક્યો છે ? - **કોષ**
739. સોયાબીનમાં શું વધુ હોય ? - **પ્રોટીન**
740. વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યો છે ? - **સ્પુટનિક**
741. વિટામીન-ડીની ઊણપથી ક્યો રોગ થાય ? - **સુકતાન**
742. ધરતીકંપના માપન માટે વપરાતું સાધન ક્યું છે ? - **સિસ્મોગ્રાફ**
743. ભાસ્કર શું છે ? - **કૃત્રિમ ઉપગ્રહ**
744. વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય કોણ છે ? - **સર જગદીશચંદ્ર બોઝ**
745. એન્ડોસ્કોપી ક્યા રોગના નિદાન માટે છે ? - **પેટના રોગો**

આયુર્વેદિક ડૉક્ટર - 2000

746. સંતરામાં ક્યું વિટામીન રહેલું છે ? - **સી**
747. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય ? - **ઉત્તર**
748. સૂર્ય કિરણમાંથી ક્યું વિટામીન મળે ? - **ડી**
749. નેત્રદાનમાં રોગીની આંખમાં શું બદલાય છે ? - **માત્ર કીકી**
750. મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને ક્યો સિદ્ધાંત આપ્યો ? - **સાપેક્ષવાદ**
751. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ છે ? - **રાકેશ શર્મા**
752. પ્રકાશ વર્ષનો ઉપયોગ શેમા થાય છે ? - **અંતર માપવા**
753. વિમાનમાં રખાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? - **નારંગી**

વૈદકિય સેવા - 2000

754. માનવ શરીરમાં હાડકાઓની સંખ્યા કેટલી છે ? - **203 (213 પણ ધ્યાને લેવાય છે)**
755. હોકાયંત્રની શોધ ક્યા દેશમાં થઈ ? - **ચીન**
756. દૂધની ઘનતા માપવા ક્યું સાધન વપરાય ? - **લેક્ટોમીટર**
757. ટેલિફોનના શોધકનું નામ જણાવો. - **એલેકઝાન્ડર ગ્રેહામ બેલ**
758. ચામડીના વિકાસ માટે ક્યુ વિટામીન જરૂરી છે ? - **D**
759. સ્પુટનિક ઉપગ્રહ ક્યા દેશે છોડ્યો હતો ? - **રશિયા**
760. લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ક્યું તત્ત્વ ભાગ લે છે ? - **ફાઈબ્રીનોજેન**
761. ઈન્સ્યૂલીન શરીરના ક્યા અંગમાં ઉત્પન્ન થાય છે ? - **સ્વાદુપિંડ**
762. વંશ-વારસાનું વિજ્ઞાન એટલે શું ? - **જિનેટિક્સ**
763. વાતાવરણમાં ક્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? - **નાઈટ્રોજન**
764. દિવસ અને રાત ક્યારે સરખા હોય ? - **21 માર્ચ, 23 ડિસેમ્બર**

આંકડાકીય અધિકારી - 2000

765. અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ હતા ? - **રાકેશ શર્મા**
766. ઈન્ફન્ટોમીટરનો ઉપયોગ શું છે ? - **નાના બાળકોનો વિકાસ દર નક્કી કરવો.**
767. જીરોન્ટોલોજી શું છે ? - **વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન**
768. માનવશરીરની 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને ક્યા નામે ઓળખાય છે ? - **DNA**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

769. રત્નો પર કોતરણી કરવાનું યંત્ર ક્યું છે? : **ગ્લિપ્ટોગ્રાફ**
770. વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે તે સાધન ક્યું છે ? : **કેસ્કોગ્રાફ**
771. ખોરાક રાંધવાની કઈ રીત ઉત્તમ ગણાય ? : **વરાળમાં બાફીને**
772. મોર ફૂડ એન્ડનો એક્ટિવિટી એટલે ક્યો રોગ ? : **મેલેરિયા**
773. ફોટોગ્રાફીની શોધ ક્યા વર્ષે થઈ હતી ? : **ઈ.સ. 1826 (જોસેફ નાઈસ્ફોર નિપ્સે)**
774. મેન્ડેલિયને આનુવંશિકતાનો સિદ્ધાંત ક્યા છોડ દ્વારા સમજાવ્યો? : **વટાણા**
775. સેફટીપીનનો શોધક કોણ છે? : **વોલ્ટરહન્ટ**
776. કાર્ડિયોગ્રામ ક્યા રોગની તપાસમાં મદદરૂપ થાય ? : **હૃદય**
777. માનવ શરીરમાં ફોસ્ફરસ ઘટી જાય તો શું થાય ? : **હાડકાં નબળા પડે**
778. વેલ્ડિંગમાં ક્યો ગેસ વપરાય ? : **એસિટિલિન, પ્રોપેન, બ્યૂટેન વગેરે (ગેસ વેલ્ડિંગમાં ઓક્સિજન)**
779. બાષ્પનું પાણી બનવાની ક્રિયાને શું કહેવાય છે ? - **ઘનીભવન**
780. ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે? : **અપ્સરા**

781. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ક્યા આવેલી છે? : **અમદાવાદ**

782. બેરીબેરી રોગ ક્યા વિટામિનની ઉણપથી થાય ? : **B**

783. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ? -**ગુરુ**

784. નાગાસાકીમાં ક્યો બોમ્બ ફેંકાયો હતો ? : ફેટ મેન **(યુરેનિયમના વિખંડનીય પદાર્થ તેમાં હતા)**

785. ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે કોણે ખ્યાતિ અપાવી ? : **વિક્રમ સારાભાઈ**

786. એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા ક્યા આવેલી છે ? : **ટ્રોમ્બે**

787. ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરતો પદાર્થ ક્યો છે? : **ફ્રીઓન**

788. ગોબર ગેસનો મુખ્ય ઘટક ક્યો છે? : **મિથેન**

789. હૃદયની કામગીરી માપવા કઈ કસોટી છે ? : **ECG**

790. હૃદયના અનિયમિત ધબકારાના સંશોધન અને ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? : **ઈલેક્ટ્રોફિઝિયોલોજી**

791. દાક્તરી વિદ્યાના પિતા કોણ છે? : **હિપોક્રેટિસ**

792. હૃદયના ધબકારા નિયંત્રણ કરતું સાધન ક્યું છે? : **પેસમેકર**

793. અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભાસ્કર શું છે? : **કૃત્રિમ ઉપગ્રહ**

794. પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ કઈ છે ? : **યુરેનિયમ**

795. LPGમાં ક્યા વાયુઓ ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરેલા હોય છે? : **પ્રોપેન અને બ્યુટેન**

796. આમળામાં ક્યું વિટામિન હોય ? : **C**

797. દૂધનું દહીમાં રૂપાંતર થાય ત્યારે તેની ખટાશ શાના લીધે હોય છે? : **લેક્ટિક એસિડ**

798. એનિમિયા ક્યા તત્વની ઉણપના કારણે થાય છે? : **લોહતત્વ**

799. લોહીનું pH બનાવનાર ખનિજ ક્યું છે? : **સોડિયમ**

800. મેલેરિયાના રોગ માટે ક્યા મચ્છર જવાબદાર છે? : **એનાફિલિસ માદા**

801. માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? : **હાઈપોથેલેસમ ગ્રંથી**

802. માનવ શરીરની નાડીઓ અને કોષિકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર ક્યું છે ? : **ન્યૂરોલોજી**

803. દૂધમાં ઉભરો ક્યા સિદ્ધાંતથી આવે ? : **પૃષ્ઠતાણ**

804. માનવ મનનું અધ્યયન કરતું વિજ્ઞાન ક્યું છે? : **સાયકલોજી**

805. ડર્મિટોલોજિસ્ટ ક્યા રોગની સારવાર કરે ? : **ચામડી**

806. ઈકોલોજી શું છે ? : **પર્યાવરણ અને દરેક જીવ**

807. ભોજનમાંથી આયર્ન મેળવવા શું વધુ ઉપયોગી થાય ? : **લીલા શાકભાજી**

808. વિમાનમાં ઉડ્ડયનના વિજ્ઞાનને શું કહેવાય ? : **એરોનોટિક્સ**

809. દર્દીને સીટીસ્કેન કરાવવા ક્યા વિભાગમાં લઈ જવો પડે ? : **રેડિયોલોજી**

810. ક્યું ભારતીયનગર અવકાશી નગર તરીકે ઓળખાય ? : **બેંગ્લોર**

811. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે ? - **શુક્ર**

812. ટમેટાંનો લાલ રંગ ક્યા તત્વને કારણે છે? : **લાયકોપેન**

813. સૂર્ય ફરતે પૃથ્વી પરિભ્રમણ કરે છે, તે સિદ્ધાંત આપનાર પ્રથમ ભારતીય કોણ હતા ? : **આર્યભટ્ટ**

814. ભારતમાં ન્યુક્લિયર વિજ્ઞાનના પિતામહ કોને કહેવાય છે? : **હોમીભાભા**

815. હાઈડ્રોલિક બ્રેક વિજ્ઞાનના ક્યા નિયમ પર કાર્ય કરે છે ? : **પાસ્કલ**

816. પ્લુટોનિયમ તત્વ કઈ ઊર્જા માટે અગત્યનું છે ? **: ન્યૂક્લિયર ઊર્જા**

817. બાગાયત કામના વિજ્ઞાનને ક્યા નામથી ઓળખાય ? **: હોર્ટિકલ્ચર**

818. પોલિયોની રસીના શોધક કોણ છે? : **જોનાસ સાલ્ક**

819. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? - **બુધ**

820. વનસ્પતિના સંવેદનો માપનાર સાધન ક્યું છે ? : **કેસ્કોગ્રાફ**

821. જિપ્સમનું રાસાયણિક નામ શું છે? : **કેલ્શિયમ સલ્ફેટ**

822. પથ્થરની ખાણમાં કામ કરતાં મજૂરને ક્યો રોગ થવાની સંભાવના રહે ? : **સિલિકોસીસ**

823. દ્રાક્ષમાં ક્યો એસિડ હોય છે? : **ટાર્ટરિક એસિડ**

824. HIV વિષાણુના શોધક કોણ છે? : **રોબર્ટ ગેલો**

825. શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું ક્યું છે? : **સાથળનું**

826. ઈન્સ્યુલીનના શોધક કોણ હતા ? : **બેન્ટિંગ અને બેસ્ટ**

827. વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ ક્યો છે? : **ઓઝોન**

828. ભેજ પાણીનું ક્યું સ્વરૂપ છે ? : **વાયુ**

829. ક્યા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતા કહેવાય ? : **AB**

830. માનવ શરીરમાં ડીહાઈડ્રેશન શા કારણે થાય ? : **પાણીના અભાવે**

831. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી ક્યું હતું ? : **કૂતરી**

832. કેન્સરના ઉપચાર માટે ક્યું તત્ત્વ વપરાય છે? : **કોબાલ્ટ 60**

833. ક્યા અંગને ચકાસવા માટે સિરમ ક્રિએટીનાઈનનો ટેસ્ટ કરવામાં આવે છે? : **કિડની**

834. ટેલિવિઝનની શોધ ક્યારે થઈ ? : **1922**

835. ભારતે રાજસ્થાનના પોખરણમાં પ્રથમ અણુધડાકો કઈ સાલમાં કર્યો ? : **1974**

836. દર સેકન્ડે પ્રકાશનો વેગ કેટલો હોય છે? : **3 લાખ કિ.મી.**

837. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યા આવેલું છે? : **થુમ્બા**

838. મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં કેટલામો ક્રમ આવે છે? : **પ્રથમ**

839. ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને ક્યા તારાજૂથનો પરિચય કરાવી શકાય ? : **સપ્તર્ષિ તારાજૂથ**

840. હવાનું દબાણ માપવાનું સાધન ક્યું છે ? - **બેરોમીટર**

841. નિપા વાઈરસનું પ્રવાહન ....**માં થયું પછી તેના દ્વારા સૂવર અસરગ્રસ્ત થયા. - ચામાચીડિયા**

842. ઈલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? : **લેડ + ટિન**

843. ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે ? : **ઋણધ્રુવ**

844. ઈલેક્ટ્રિક જનરેટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે? : **યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે.**

845. વોશિંગ મશીન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? - **કેન્દ્રત્યાગી**

846. કોપર + ટિનથી બનતી મિશ્રધાતુનું નામ જણાવો. : **કાંસુ**

847. વીજ પ્રવાહનો મૂળભુત SI એકમ .... છે. : **એમ્પીયર**

848. ઈલેક્ટ્રોલાઈટની સ્પેસિફિક ગ્રેવિટી શેના દ્વારા માપી શકાય ? : **હાઈડ્રોમીટર**

849. હાસ્ય વાયુ/ લાફીંગ ગેસ અન્ય ક્યા નામે ઓળખાય છે ? - **નાઈટ્રસ ઓક્સાઈડ**

850. અંડકોષમાં રંગસૂત્રો કેટલાં હોય છે ? : **23 જોડ**

851. દિવેટવાળા સ્ટવમાં કેરોસીન પ્રવાહીના ક્યા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ? : **કેશાકર્ષણ**

852. વિજ ઢોળ ચડાવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે ? - **જળ વિશ્લેષણ**

853. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યા અંગમાં થાય છે ? : **કિડની**

854. 'There is plenty of room at the bottom' આ વિધાન ક્યા વૈજ્ઞાનિકે સૂચવ્યું ? : **રિચાર્ડ ફેઈનમેને**

855. હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે? : **બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ**

856. વસ્તુને ક્યા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ? : **વક્રતા કેન્દ્ર પર**

857. ક્ષ-કિરણોના શોધક જણાવો. - **રોન્ટજન**

858. ધોવાના સોડા સાથે સંબંધિત રાસાયણિક નામ જણાવો. - **સોડિયમ કાર્બોનેટ**

859. એક પુસ્તક અને ચાંદીનો ચમચો રૂમમાં પડેલ છે, ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે કારણ કે - **ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે**

860. ....તરંગો જીવજંતુઓને મારી શકે છે. - **અલ્ટ્રાસોનિક**

861. ....તરંગો ગંદા કપડામાંથી ધૂળને દૂર કરીને સાફ કરી શકે છે ? - **અલ્ટ્રાસોનિક**

862. કેલ્શિયમની દૈનિક જરૂરિયાત કેટલા mg હોય છે ? - **100**

863. સ્વચ્છ આકાશ વાદળી/આસમાની રંગનું શા કારણે દેખાય છે ? - **પ્રકાશનો વિક્ષેપ**

864. બેટરી ચાર્જરથી શું થાય ? - **વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર**

865. ડેન્ગ્યુ મચ્છર સામાન્ય રીતે ક્યા વિસ્તારમાં વધારે જોવા મળે છે ? - **ઉષ્ણકટીબંધીય**

866. LPGમાં મુખ્યત્વે ....નો સમાવેશ થાય છે. - **મિથેન, બ્યુટેન અને પ્રોપેન**

867. અવાજનું પ્રદૂષણ ક્યા યુનિટમાં માપવામાં આવે છે ? - **ડેસિબલ**

868. માઈક્રોસ્કોપના શોધક કોણ છે ? - **ઝેડ, જન્સેન**

869. ORS - ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશનના એક લીટર પાણીમાં સોડિયમ બાઈકાર્બોનેટનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે ? - **2.5 ગ્રામ**

870. ....થી રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય ? - **બેટરી**

871. સેલ્યુલર ફોનના પિતા કોને કહેવામાં આવે છે ? - **માર્ટિન કુપર**

872. ટેલીગ્રાફના શોધક કોણ છે ? - **સેમ્યુઅલ મોર્સ**

873. ORS - ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશનના એક લીટર પાણીમાં પોટેશિયમ ક્લોરાઈડનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે ? - **1.5 ગ્રામ**

874. કેલ્ક્યુલેટિંગ મશીનના શોધક કોણ છે ? - **પાસ્કલ**

875. .... તરંગો રોગોના નિદાનમાં ઉપયોગી છે ? - **અલ્ટ્રાસોનિક**

876. DDT (ડાયક્લોરો ડાયફીનાઈલ ટ્રિક્લોરોઈથેન)ના શોધક કોણ છે ? - **પૌલ મુલ્કર**

877. .... વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે ? - **વોશિંગ મશીન**

878. હોમિયોપેથીના શોધક કોણ છે ? - **હાહમેમાન**

879. બરફને ઓગળતો અટકાવવા ઉપયોગ થાય છે. - **જીલેટીનનો**

880. મનુષ્યની કિડનીની પથરીમાં મળી આવતું રાસાયણિક સંયોજન .... છે. - **કેલ્શિયમ ઓક્ઝાલેટ**

881. પાણીમાં અવાજ માપવા ક્યું સાધન વપરાય છે ? - **હાઈડ્રોફોન**

882. વીજળીનો ગોળો કોણે શોધ્યો હતો ? - **થોમસ એડીસન**

883. પ્રોટોન ટ્રાન્સફર થીયરી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - **બ્રોન્સ્ટેડ લોરી**

884. એટોમીક થીયરીના શોધક કોણ છે ? - **ડાલ્ટન**

885. ....તરંગો ઓટોમેટીવ દરવાજાનું સંચાલન કરી શકે છે. - **અલ્ટ્રાસોનિક**

886. ....યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. - **ડાયનેમો**

887. ઓરી (મિઝલ્સ) કઈ રીતે ફેલાતો રોગ છે ? - **હવાથી**

888. શું સ્ટીલ, બ્રોન્ઝ અને બ્રાસ જેવું છે ? - **મેગ્નેલિયમ**

889. મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ? - **2**

890. લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે ક્યા દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે ? - **કોપર સલ્ફેટ**

891. દૂર દૂર આવેલા તેજસ્વી પદાર્થોના તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ? - **પાયરોમીટર**

892. નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિમિનિટ.......... આસપાસ હોય છે. - **40**

893. હાઈડ્રોમીટર એ .... માટેનું સાધન છે. - **પ્રવાહીની વિશિષ્ટ ઘનતાને માપવા**

894. ખડકો, જમીનના સ્તરો અને જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ? - **જીઓલોજી**

895. સ્ટીમ એન્જિનના શોધક તરીકે કોણ ઓળખાય છે ? - **જેમ્સ વોટ**

896. ઝડપ માપવા માટે ક્યું સાધન વપરાય ? - **ઓડોમીટર**

897. ટેલિફોનના શોધક જણાવો. - **એલેકઝાન્ડર ગ્રેહામ બેલ**

898. લોલકના નિયમો આપ્યા હતા. - **ગેલેલિયો**

899. યકૃતને નુકસાન કરતા રસાયણોને ....કહે છે. - **હિપેટો ટોક્સિન**

900. બી.સી.જી. રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? - **ક્ષય**

901. પાણી શુદ્ધિકરણની પદ્ધતિઓમાં સામાન્ય રીતે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે ? - **વધુ સાંદ્રતાવાળુ હાઈપોલોરાઈડ, જળશુદ્ધિકરણની રૂઢિગત પદ્ધતિઓ, ક્લોરીનનું દ્રાવણ**

902. ત્રિગુણી રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? - **ડિફથેરિયા, ધનુરવા, ઉંટાટિયું**

903. ઈન્સ્યુલીનના શોધક કોણ હતા ? - **બેન્ટિંગ અને બેસ્ટ**

904. Veriola નામના વાયરસથી ક્યો રોગ થાય છે ? - **શીતળા**

905. થીયામીનની ઉણપથી ક્યો રોગ થાય છે ? - **બેરીબેરી**

906. શ્વેતકણોનું જન્મ સ્થાન શરીરમાં ક્યા હોય છે ? - **અસ્થિ મજ્જા**

907. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ? - **ડાય હાઈડ્રોજન**

908. હવા એ......... છે. - **મિશ્રણ**

909. પૃથ્વીના વાતાવરણમાં 'ઓઝોન હોલ'ને કારણે ક્યા કિરણો પ્રવેશે છે ? - **અલ્ટ્રાવાયોલેટ કિરણો**

910. પોલિયો મુખ્યત્વે Polivirus જે એક RNA છે. તે કેટલા પ્રકારના હોય છે ?- **3**

911. આયોડીનની ઉણપથી ક્યો રોગ થાય છે ? - **ગોઈટર**

912. કમ્પ્યૂટરના શોધક તરીકે કોણ ઓળખાય છે ? - **ચાર્લ્સ બેબેજ**

913. ORS - ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશનનો એક લીટર પાણીમાં સોડિયમ ક્લોરાઈડનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે ? - **3.5 ગ્રામ**

914. રુધિરનું દબાણ માપવા ક્યું સાધન વપરાય છે ? - **સ્ફીગમોમેનોમીટર**

915. વિટામીન B-12ની ખામીથી ક્યો એનીમિયા થાય છે ? - **પરનીસીયસ એનીમિયા**

916. એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ ? - **120 તથા 80**

917. પ્રોટીનની ખામીથી બાળકોમાં ક્યો રોગ થાય છે ? - **મેરાસ્મસ ક્વોશીયોરકોર**

918. ફેધમ ....ના આકલનનું એકમ છે. - **ઊંડાણ**

919. પ્રકાશની ગતિ જણાવો. - **2,99,792 કિ.મી./સેકંડ**

920. દૂધમાં ક્યું વિટામીન હોતું નથી ? - **સી**

921. વાળનો રંગ કાળો શાના લીધે છે ? - **મેલેનીન**

922. ફોટો વોલટિક સેલ કઈ બાબત સાથે સંકળાયેલા છે ? - **સોલાર એનર્જી**

923. વિટામીન 'સી'ના અભાવથી ક્યો રોગ થાય છે ? - **સ્કર્વી**

924. એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઊર્જા મળે ? - **4.1 કેલરી**

925. લાલ કીડીમાં ક્યો એસિડ હોય છે ? - **ફોર્મિક એસિડ**

926. હ્યુમિડિટી માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય ? - **હાઈગ્રોમીટર**

927. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે? - **ત્રિદલ વાલ્વ તથા દ્વિદલ વાલ્વ**

928. લિથિયમ ....ધાતુ છે. - **હલકી**

929. શામા અંડકોષનું સર્જન થાય છે ? - **અંડકમાં**

930. ઉત્સેચકોનું નિર્માણ શાના દ્વારા નિયંત્રિત છે ? - **જનીન**

931. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શાના દ્વારા થાય છે ? - **થાઈરોઈડ**

932. લાળગ્રંથિ ક્યા ઉત્સેચકનો સ્રાવ કરે છે ? - **એમાયલેઝ**

933. ઈન્સ્યુલિનનો સ્રાવ પ્રેરતું અંગ ક્યું છે ? - **સ્વાદુપિંડ**

934. ક્યા સંજોગોમાં યેલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે ? - **ગરમી માટેની સાવચેતી**

935. 'રજત ક્રાંતિ' શબ્દો શેના માટે વપરાય છે ? - **ઈંડા ઉત્પાદન માટે**

936. ટિયર ગેસ (અશ્રુ વાયુ)માં ક્યો પદાર્થ હોય છે ? - **ક્લોરોપિક્રીન**

937. શરીરમાં જ્યારે ચેપ લાગે છે ત્યારે તેનો વિરોધ કોણ કરે છે ? - **WBC**

938. ક્યો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે ? - **અગ્રકપાલી ખંડ**

939. મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ? - **ચતુષ્કકાય**

940. નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે તેને શું કહે છે ? - **રુધિર કેશિકા**

941. રૂધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ? - **હૃદયના વાલ્વો અને પટલો તથા હૃદયના ખંડો**

942. અકાર્બનિક ખનીજતત્ત્વો વનસ્પતિમાં ક્યા સ્વરૂપે જોવા મળે છે ? - **અતિ મંદ દ્રાવણ**

943. ઈલેક્ટ્રોનની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી ? - **જે.જે.થોમસન**

944. રુધિર દબાણ (BP) માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? - **સ્ફીગ્મોમેનોમીટર**

945. ડિઝલ એન્જિનના શોધક કોણ છે ? - **રૂડોલ્ફ**

946. પોટેશિયમનો મુખ્ય ઉપયોગ ક્યો છે ? - **તે ઉત્સેચકોના સ્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે.**

947. અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ? - **એસિડ**

948. વાલ્વયુક્ત રૂધિર વાહિનીઓને શું કહે છે ? - **શિરા**

949. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે ? - **જિપ્સમ**

950. સિલિકોન કાર્બાઈડનો ઉપયોગ કઈ બાબત માટે કરવામાં આવે છે ? - **ખૂબ જ સખત પદાર્થો કાપવા માટે**

951. ઉષ્ણતામાન 40 અંશ સે. હોય તો તે ફેરનહીટમાં કેટલું કહેવાય ? - **104 ફેરનહીટ**

952. તારાઓ સામાન્ય રીતે ક્યા વાયુઓના બનેલા હોય છે ? - **હાઈડ્રોજન, હિલિયમ**

953. ત્રિગુણી રસીથી ક્યા રોગનું રક્ષણ થતું નથી ? - **ટાઈફોઈડ**

954. S અને P તરંગો શાની સાથે સંબંધિત છે ? - **ભૂકંપ**

955. નીચેનામાંથી કોણ મિથેનનો સ્રોત છે ? - **વેટલેન્ડ (આદ્ર સ્થળ)**

956. નિપા વાઈરસનું મનુષ્યમાં પ્રવાહન કોના સીધા સંપર્કથી થાય છે ? - **ચેપગ્રસ્ત સૂવર કે ચામાચીડિયાના**

957. કોઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર ક્યું છે ? - **$2n^2$**

958. તાજેતરમાં જોવા મળેલ નિપાહ વાઈરસ કોના દ્વારા ફેલાતો હોવાનું મનાય છે ? - **ચામાચીડિયું- ભૂંડ**

959. પાકા ટામેટાંનો લાલ કલર કોને આભારી છે ? - **કેરોટીનોઈડ્સ**

960. ક્યા પ્રકારની માટીને પલાળવામાં આવે ત્યારે તે ફુલે છે અને સૂકાય ત્યારે તેમાં તિરાડો પડે છે ? - **કાળી માટી**

961. વિનેગારમાં ક્યો એસિડ હોય છે ? - **એસિટિક એસિડ**

962. સમુદ્રની ઉંડાઈ માપવા ક્યું સાધન ઉપયોગી છે ? - **ફેધોમીટર**

963. કઈ પ્રવિધિને બાળકનું પિતૃત્વ સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે ? - **DNA આંગળાની છાપ/ ફિંગરપ્રિન્ટિંગ**

964. સૂર્યમાં અણુ એકીકરણની પ્રક્રિયા માટે શું જરૂરી છે ? - **ખૂબ ઊંચુ તાપમાન અને ખૂબ ઊંચુ દબાણ**

965. વાતાવરણમાં ભેજના ફેરફાર દર્શાવતા વૈજ્ઞાનિક સાધનને શું કહે છે ? - **હાઈગ્રોસ્કોપ**

966. ન્યૂટ્રોનના શોધકનું નામ જણાવો. - **ચેડવિક**

967. ફોબોસ અને ડિમોસ ક્યા ગ્રહના ઉપગ્રહો છે ? - **મંગળ**

968. ઈથાઈન વાયુનું ઔદ્યોગિક નામ શું છે ? - **એસિટિલીન**

969. સુકી હવામાં શૂન્ય ડિગ્રી (0°) તાપમાને અવાજની ગતિ જણાવો. - **1087 ફૂટ/સેકન્ડ**

970. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં સૌથી વધુ પ્રમાણ ક્યા ગેસનું હોય છે ? - **મિથેન**

971. એરોપ્લેનની શોધ કોણે કરી હતી ? - **રાઈટ બ્રધર્સ**

972. મીઠાનું રાસાયણિક નામ જણાવો. - **સોડિયમ ક્લોરાઈડ**

973. અનુમસ્તિષ્ક અને સેતુ મગજના ક્યા ભાગમાં આવેલું છે ? - **પશ્ચ મગજ**

974. આવર્ત કોષ્ટકની રચના ક્યા વૈજ્ઞાનિકની શોધને આભારી છે ? - **મેન્ડેલીફ**

975. રેડિયમના શોધક કોણ છે ? - **મેરી ક્યુરી અને પેરી ક્યુરી**

976. પોટેશિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર ક્યું છે ? - **$KA_1 (OH)_4$**

977. કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધની શરીર પર અસર થાય છે ? - **PHBV**

978. જે રીતે રબર વૃક્ષ સાથે સંબંધિત છે તે જ રીતે રેશમ....... સાથે સંબંધિત છે. - **જંતુ**

979. ફટકડીનું રાસાયણિક નામ શું છે ? - **પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ**

980. દરિયાઈ પાણીની સરેરાશ ખારાશ...... હોય છે. - **3.5%**

981. વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? - **ફેરાડેએ**

982. દાંતનું બહારનું પડ .....નું બનેલું છે. - **કેલ્શિયમ ફોસ્ફેટ**

983. ....અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે. - **આયોડિન**

984. શરીરમાં રક્તકણો ક્યા બને છે ? - **હાડકાના પોલાણમાં**

985. લાલ કીડીના શરીરમાના ....એસિડને લીધે ચટકો ભરે તો બળતરા થાય છે. - **ફોર્મિક એસિડ**

986. કઈ પશુની ઓલાદ ઘેટાની છે ? - **પાટણવાડી**

987. ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે ક્યો વાયુ ઉપયોગમાં લેવાય છે ? - **SO_2**

988. જમીનના અભ્યાસને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - **પીડોલોજી**

989. ....શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે. - **જનીનતત્ત્વો**

990. રંગસૂત્રોની જોડ વાંદરામાં કેટલી હોય છે ? - **21 જોડ**

991. ઈલેક્ટ્રીક મોટર શક્તિનું રૂપાંતરણ કરે. - **વીજશક્તિનું યાંત્રિકશક્તિમાં**

992. ટેલિવિઝનના શોધક જણાવો. - **જહોન લોગી બેઈર્ડ**

993. લોખંડમાં કાટ લાગવાથી તેનું વજન.... - **વધે છે.**

994. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ.........છે. - **6.5m**

995. કાર ચાલકની સલામતી માટેની એર બેગમાં શું હોય છે ? - **સોડિયમ એઝાઈડ**

996. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રૂસ્તમ એટલે ? - **માનવરહિત વિમાન**

997. છાશમાં ક્યો એસિડ જોવા મળે છે ? - **લેક્ટિક એસિડ**

998. પારો ધાતુ અન્ય ધાતુમાં મિશ્રિત થઈ શકે છે આ વિધાન... - **સત્ય છે.**

999. ચિરોડીનું રાસાયણિક નામ જણાવો. - **કેલ્શિયમ સલ્ફેટ ડાઈહાઈડ્રેટ**

1000. કઈ ધાતુ ઉત્કૃષ્ટ કહેવાય છે ? - **સોનું, ચાંદી, પ્લેટિનમ**

1001. લેબોરેટરીમાં લોહીના પરીક્ષણ માટે સૌથી વધુ વપરાતું એન્ટિકોએગ્યુલેન્ટ ક્યું ? - **ઈથિલીન ડાયએમાઈન ટેટ્રા એસેટીક એસિડ**

1002. સિલ્વર આયોડાઈડનો ઉપયોગ શેમાં થાય છે ? - **કૃત્રિમ વર્ષા**

1003. મધમાખીના વિષમાં ક્યો પદાર્થ હોય છે ? - **મેલીટીન**

1004. યુરેનસ ગ્રહ પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે ? - **પૂર્વથી પશ્ચિમ દિશામાં**

1005. ટાઈપરાઈટરના શોધક કોણ હતા ? - **ક્રિસ્ટોફર શોલ્સ**

1006. ટામેટામાં ક્યો એસિડ હોય છે ? - **ઓક્ઝેલિક એસિડ**

1007. પૃથ્વી ઉપર સૌથી સખત કુદરતી તત્વ ક્યું છે ? - **હીરો**

1008. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અર્જુન શું છે ? - **યુદ્ધ ટેન્ક**

1009. લોહીમાં કેલ્શિયમના સ્તરના **નિયંત્રણ** માટે જવાબદાર અંતઃસ્રાવ ક્યો ? - **પેરાથાયરોઈડ હોર્મોન**

1010. ઈસ્ચેરિચીયા કોલી કેવા પ્રકારના **બેક્ટેરિયા** છે ? - **ગ્રામ નેગેટીવ રોડ**

1011. જીવંત અને મૃત શુક્રાણુઓને અલગ પાડવા માટે વપરાતી સ્ટેનિંગ પદ્ધતિ જણાવો. - **ઈઓસિન-નિગ્રોસિન સ્ટેનિંગ**

1012. નાના આંતરડામાંથી નિર્માણ થતો લૅક્ટોઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે ? - **ગેલેક્ટોઝ**

1013. મરઘામાં રાનીખેતની બિમારી ક્યા વાયરસના કારણે થાય છે? - **પેરામીક્સો વાયરસ**

1014. યુરેનસ ગ્રહ પૃથ્વીથી આશરે કેટલા ગણો મોટો છે ? - **ચાર ગણો**

1015. મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે મળી આવતું કિરણોત્સર્ગી તત્વ શું છે ? - **પોટેશિયમ 40**

1016. શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌપ્રથમ રક્ત કોષ ક્યો ? - **ન્યૂટ્રોફિલ**

1017. ગેલ્વેનાઈઝ આયર્નશીટ ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ? - **જસત**

1018. દૂધના સ્રાવ માટે ક્યો અંતઃસ્રાવ જવાબદાર છે ? - **ઓક્સીટોસિન**

1019. શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં **પરિક્ષણ** માટે દવાની વિષકતાની ચકાસણી કરવા, પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્યા અંગના નમૂના લેવામાં આવે છે ? - **યકૃત**

1020. રેડિયોના શોધક જણાવો. - **જી.માર્કોની**

1021. સામાન્ય રીતે ઈલેક્ટ્રીક બલ્બમાં ભરવામાં આવતો ગેસ....... છે. - **નાઈટ્રોજન**

1022. સૌથી ઓછા રંગસૂત્ર નંબર ધરાવતું પ્રાણી ક્યું ? - ભેંસ

1023. વ્હાઈટ મસલ ડીસીઝ થવાનું કારણ જણાવો. - **વિટામીન 'ઈ'ની ઉણપ**

1024. કૃત્રિમ બીજદાન માટે વીર્યની નળીને પ્રવાહી નાઈટ્રોજનમાં કેટલા તાપમાને સાચવી રાખવામાં આવે છે ? - **-196 ડિગ્રી સેન્ટીગ્રેડ**

1025. ઘેટામાં બચ્ચાંને જન્મ આપવાની રીતને શું કહેવાય છે ? - **લેમ્બિંગ**

1026. પશુચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ ક્યા નામથી ઓળખાય છે ? - **નેક્રોપ્સી**

1027. નાઈટ્રોગ્લિસરીનનો ઉપયોગ શેમા થાય છે ? - **વિસ્ફોટક તરીકે**

1028. સૌથી મોટો વાયરસ જણાવો. - **પોક્ષ**

1029. ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં ક્યો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ? - **બ્યુટેન**

1030. વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ ક્યો છે ? - **ઓઝોન**

1031. ધાતુની શુદ્ધતા........ની મદદથી નક્કી થઈ શકે છે. - **આર્કિમિડીઝનો સિદ્ધાંત**

1032. એક્સ-રે મશીનના શોધક કોણ હતા ? - **રોન્ટજન**

1033. વીજળીના ગોળાની ફિલામેન્ટ........ની બનેલી હોય છે. - **ટંગસ્ટન**

1034. કોણ સ્ટ્રેન્જર ગેસ તરીકે પણ ઓળખાય છે ? - **ઝિનોન**

1035. લઠ્ઠા (દારૂ) કરૂણાંતિકાઓમાં અંધત્વ તરફ દોરી જતું વાંધાજનક પદાર્થ ....છે. - **મિથાઈલ આલ્કોહોલ**

1036. રક્ત શર્કરાના નિયંત્રણમાં કોની સંડોવણી ખૂબ જ જરૂરી છે? - **સ્વાદુપિંડ**

1037. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અરિહંત એટલે શું ? - **અણુ સબમરીન**

1038. હેલિકોપ્ટરના શોધક કોણ હતા ? - **ઈગોર સિર્કોસ્કિ**

1039. ક્યા તેલમાં મહત્તમ પ્રોટીન સામગ્રી છે ? - **સોયાબીનનું તેલ**

1040. ક્યો પુખ્ત વયના લોકોમાં જોવા મળતો સામાન્ય રોગ, ડાયાબિટીસ મેલીટસ સાથે સંકળાયેલો છે ? - **રક્તમાં શર્કરાનું ઊંચુ સ્તર અને રક્તમાં ઈન્સ્યુલીનનું નીચું સ્તર**

1041. હોમોફિલિયા/રક્તસ્રાવિતા એક આનુવંશિક ગરબડ છે, જે .... તરફ દોરી જાય છે. - **શ્વેત રક્તકણોમાં ઘટાડો**

1042. લાકડું, અનાજ, ખાંડ અને મ્યુનિસિપલ કચરા જેવા પદાર્થોમાં સંઘરાયેલ સૌર ઊર્જાને .... કહે છે. - **બાયોમાસ**

1043. કોના ઝેરના કારણે ઈટાઈ-ઈટાઈ રોગ થાય છે ? - કેડમિયમ

1044. અંતર્ગ્રહો ક્યા છે? - **બુધ અને શુક્ર**

1045. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નાલિકામય ગ્રંથિ ધરાવે છે ? - **3**

1046. કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધની શરીર પર અસર થાય છે ? - **PHBV**

1047. ઓર્નિથોલોજી કઈ બાબત સાથે સંબંધિત છે ? - **પક્ષીઓ**

1048. ગ્લુકોઝના અણુનું પુર્ણદહન થતાં કેટલા ATP મળે છે ? - **38**

1049. દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતો ઉત્સેચક ક્યો છે ? - **લેક્ટોઝ**

1050. અતિ ઊંચા તાપમાન માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ? - **પાયરોમીટર**

1051. ગોઈટરનો રોગ ખોરાકમાં ....ની ઉણપથી થાય છે. - **આયોડીન**

1052. ક્યા તત્વના પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં એક ઈલેક્ટ્રોન હોય છે ? - **સોડિયમ**

1053. સૌથી ઊંચી કક્ષાનો કોલસો ક્યો છે ? - **એન્થ્રેસાઈટ**

1054. કઈ પટ્ટીને ઊંચા તાપમાને ગરમ કરતા તે સફેદ અને અતિ તેજસ્વી જ્યોતથી સળગી ઊઠે છે ? - **મેગ્નેશિયમની પટ્ટી**

1055. ORS - ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશનના એક લીટર પાણીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે ? - **20 ગ્રામ**

1056. જસત અને તાંબામાં સૌથી વધુ **ક્રિયાશીલ** ધાતુ કઈ છે ? - **જસત**

1057. માનવ શરીરના લોહીના બ્લડ ગ્રૂપમાં + અથવા -ની નિશાની લોહીમાં શું દર્શાવે છે ? - **Rh ફેક્ટર**

1058. ક્યા વાયુની હવામાં હાજરીને કારણે પિત્તળ હવામાં રંગવિહીન થઈ જાય છે ? - **હાઈડ્રોજન સલ્ફાઈડ**

1059. પાણીમાં વિદ્યુત પસાર કરવાથી હાઈડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે. જે ક્યુ પરિવર્તન છે ? - **રાસાયણિક પરિવર્તન**

1060. ક્યું ઉપકરણ દરિયાની ઊંડાઈ માપવાનું કામ કરે છે ? - **ફેધોમીટર**

1061. દેડકાનું બાળક ક્યા નામે ઓળખાય છે ? - **ટેડપોલ**

1062. ફિઝીયોલોજી કઈ બાબત સાથે સંકળાયેલ છે ? - **શરીર**

1063. પાણીની વરાળમાંથી વાદળ બંધાતા શાની જરૂર પડે છે ? - **ધૂળના રજકણોની**

1064. શેનો ઉપયોગ પ્રબળ ભેજશોષક તરીકે થાય છે ? - **ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ**

1065. મોબાઈલ ફોનની બેટરીમાં મોટાભાગે શેનો ઉપયોગ થાય છે? - **લિથિયમ**

1066. પોટેશિયમ પેરમેંગેનેટનું આણ્વીક સૂત્ર ક્યું છે ? - **$KMnO_4$**

1067. સ્ટેઈનલેસ સ્ટીના ઘટક તત્ત્વો ક્યા છે ? - **આયર્ન, ક્રોમિયમ અને નિકલ**

1068. માનવ શરીરમાં રૂધિરનું ગાળણ ક્યા અંગમાં થાય છે? - **મૂત્રપિંડ**

1069. મનુષ્યમાં ઉત્સર્ગ એકમ ક્યો છે ? - **મૂત્રપિંડ નલિકા (વૃક્કાણુ)**

1070. નોનસ્ટીક રસોઈના વાસણો.........થી આવરણયુક્ત છે. - **ટેફલોન**

1071. 'બુલેટપ્રૂફ કાચ' શેનો બનેલો હોય છે ? - **હાઈસ્ટ્રેન્થ પ્લાસ્ટિક**

1072. ક્યા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહિટના માપક્રમ સરખા હોય છે ? - **-40**

1073. સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનમાં લોખંડમાં કાચી ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે ? - **ક્રોમિયમ અને નિકલ**

1074. લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)માં શું હોય છે ? - **બ્યુટેન, આઈસોબ્યુટેન અને પ્રોપેન**

1075. ગોઈટર રોગમાં કઈ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે ? - **થાઈરોઈડ**

1076. માનવીની ખોપરીમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે ? - **29**

1077. બોટનીનો અભ્યાસ કઈ વસ્તુ સાથે જોડાયેલ છે ? - **છોડ**

1078. એક હોર્સપાવર બરાબર કેટલા વોટ થાય ? - **747**

1079. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? - **મરક્યુરી**

1080. અણુ વિદ્યુતમથકમાં ઉત્પાદિત થતી રાખ શાનું ઉદાહરણ છે ? - **આડપેદાશ**

1081. આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય તે ક્યા રોગનું ચિહ્ન છે ? - **ન્યૂમોનિયા**

1082. હવામાના ક્યા વાયુના કારણે પિત્તળ ઝાંખુ પડે છે ? - **હાઈડ્રોજન સલ્ફાઈડ**

1083. એક ઔંસ = કેટલા ગ્રામ થાય ? - **28.35 ગ્રામ**

1084. સામાન્ય રીતે વિદ્યુત બલ્બમાં ભરવામાં આવતો વાયું ક્યો છે? - **નાઈટ્રોજન**

1085. પૃથ્વી પર મળતો સૌથી વધુ સખત પદાર્થ ક્યો છે ? - **હીરો**

1086. છોડમાં ઉપસ્થિત ઝાયલમ એ ....ના પરિવહન માટે જવાબદાર છે. - **પાણી**

1087. એન્થ્રોપોલોજી કઈ બાબત સાથે જોડાયેલ છે ? - **માનવી**

1088. સખત પાણીને નરમ પાણીમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે ? - **ચુનો**

1089. રૂથરના કણ વિક્ષેપ પ્રયોગનો નિષ્કર્ષ... - **બધા પોઝીટીવ આયન નાના કણમાં જમા કરાવવામાં આવે છે.**

1090. વેગમાન એ.....સાથે સૌથી નજીકથી સંકળાયેલ છે ? - **બળના આઘાત**

1091. પદાર્થની બાષ્પ...... તાપમાને વાયુ તરીકે વર્તે. - **ક્રિટીકલ તાપમાન કરતા ઉપરના**

1092. હાલમાં સંશોધકો ઈંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ? - **કોલ્ડ પ્લાઝમા થેરાપી**

1093. કઈ સોમેટીક સેલમાંથી ઘેટું 'ડોલી' બનાવવાની ટેકનિક છે ? - **પ્રતિરૂપણ**

1094. વીડિયો ગેમના શોધક કોણ હતા ? : **બુશનેલ**

1095. ક્ષય રોગના જીવાણું કોણે શોધી કાઢ્યા હતા ? : **રોબર્ટ કોચ**

1096. ડાયાલિસિનો સંબંધ કઈ બાબત સાથે છે ? : **કિડની**

1097. હડકવાની રસીના શોધક કોણ છે? : **લુઈસ પાશ્ચર**

1098. એસિડ + ધાતુ-ઑક્સાઈડ ? : **ક્ષાર + પાણી**

1099. વિદ્યુતદબાણ માપવાનું સાધન ક્યું છે ? - **વોલ્ટમીટર**

1100. એસ. ચંદ્રશેખરનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? - **ખગોળ ભૌતિક**

1101. ફૂડ પોઈઝનીંગને કારણે ખોરાક/પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામાં આવે છે ? - **ડિસફેજિયા**

1102. ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી ? - **જોસેફ પ્રીસ્ટલી**

1103. સર્વાઈકલ કેન્સરના નિદાન માટે ક્યો ટેસ્ટ જરૂરી છે ? - **પેપ ટેસ્ટ**

1104. પ્લાસ્ટર ઓફ પેરિસમાં ક્યા રસાયણનો ઉપયોગ થાય છે ? - **કેલ્શિયમ સલ્ફેટ**

1105. રુધિર જૂથના શોધક કોણ છે ? - **કાર્લ લેન્ડસ્ટિનર**

1106. હાઈપોથેલોમસ કોને જોડે છે ? - **અગ્ર મગજ અને પશ્ચ મગજ**

1107. અભય દીવાની શોધ કોણે કરી હતી ? - **હંફ્રી ડેવી**

1108. ક્યું વીજચુંબકીય પ્રકૃતિ ધરાવતું નથી ? - **કેથોડ કિરણો**

1109. લેન્સના પાવરની માપણી.......માં થાય છે. - **ડાયોપ્ટર્સ**

વિજ્ઞાન અને ટેકનોલોજી

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

1. ઈન્ડીયન રીજીઓનલ નેવીગેશન સેટેલાઈટ સિસ્ટમ 1D (IRNSS-1 D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો?
A) 7 ડિસેમ્બર, 2014 B) 10 નવેમ્બર, 2014
C) 28 માર્ચ, 2015 D) 8 જાન્યુઆરી, 2015

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

2. ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે તેનું પૂરું નામ શું છે ?
A) Global positioning System
B) Global positioning Service
C) General positioning System
D) Global Point Service

3. S.A.Cનું પૂરું નામ શું છે ?
A) Science Awarness Centre
B) Sarabhai Application Centre
C) Space Appiications Centre
D) Space Aeronotic Centre

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

4. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ?
A) થેલ્સ B) આઈઆરએસ C) રોહીણી D) આર્યભટ્ટ

5. કોસ્મીલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ?
A) વનસ્પતિ શાસ્ત્ર B) અંતરિક્ષ વિજ્ઞાન
C) ભૂસ્તર શાસ્ત્ર D) હસ્તરેખા વિજ્ઞાન

6. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
A) ગાંધીનગર B) અમદાવાદ C) વડોદરા D) રાજકોટ

GPSC પેપર - 2 - 2017

7. ભારતના કયા પ્રથમ રાજ્યએ ઈન્ટરનેટ ઉપલબ્ધીને (Access to internet) મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે ?
A) પંજાબ B) તામિલનાડુ C) કેરળ D) આંધ્રપ્રદેશ

8. સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ?
A) નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ B) નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન
C) નેટવર્ક ફીડબેક કંટ્રોલ D) નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન

9. ભારત સરકારની પહેલ "મેઘરાજ" .... છે.
A) કૃષિ ડેટા એનાલીટીક્સ સોફ્ટવેર
B) સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટીંગ એન્વાયરમેન્ટનો સમૂહ
C) ઈ-ગર્વનન્સના અમલીકરણ માટેના સિદ્ધાંતોનો સમૂહ
D) દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કમ્પ્યુટર

10. પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે .... પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય.
A) 1 જાન્યુઆરી, 1963 પહેલા
B) 1 જાન્યુઆરી, 1967 પહેલા
C) 1 જાન્યુઆરી, 1995 પહેલા
D) 1 જાન્યુઆરી, 1998 પહેલા

11. "કેપ્ચા" (Captcha) .... માટે વપરાય છે.
A) પાસવર્ડ એન્ક્રિપ્ટીંગ B) સ્ટેગ્નોગ્રાફી
C) બોટ્સની ચકાસણી માટે D) છબીઓ લેવા

12. ઈલેક્ટ્રોનીક વૉલેટ (ઈ-વોલેટ્સ) .... દર્શાવે છે.
A) સેમિ કન્ડકટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ
B) ડીજીટલ લોક જડેલા વૉલેટ
C) સ્માર્ટ / ક્રેડીટ / ડેબીટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ
D) સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ

13. ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલીકોપ્ટરનું ઉત્પાદન કરશે ?
A) ફ્રાંસ B) રશિયા C) યુ.એસ.એ. D) ઈઝરાઈલ

14. ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (Exclusive Meteorological Satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે?
A) INSAT-2 B) GSAT-18 C) GSAT-10 D) KALPANA-1

15. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ?
A) SATYAM B) VYAYAM
C) PRANAYAM D) ઉપરના પૈકી કોઈ નહીં

16. કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ
A) વધે છે B) ઘટે છે
C) સરખી રહે છે D) અંદાજી ન શકાય

1)C, 2)A, 3)C, 4)D, 5)B, 6)B, 7)C, 8)B, 9)B, 10)B, 11)C, 12)D, 13)B, 14)D, 15)A, 16)A.

17. ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે?
A) નવી દિલ્હી B) મોહાલી C) કોચીન D) મુંબઈ

18. ક્લાઉડ કમ્પ્યુટીંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિ:શુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ .... છે.
A) મેઘરાજ B) મેઘદૂત C) બરખા D) બાદલ

19. "Googol" શું છે ?
A) સર્ચ એન્જિન B) એક જાતનો ઉંદર
C) દશની સો ઘાત D) વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ

20. પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લોન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ?
A) PSLV B) GSLV
C) ASLV D) GSLV Mark III

21. GLONASS કોનું અવકાશી ભૌગોલિક સંશોધક નક્ષત્ર તંત્ર (Space borne navigation Constellation System) છે ?
A) રશિયા B) યુરોપ C) ચીન D) ફ્રાન્સ

22. હાલમાં ચાલી રહેલ ભારત - યુ.એસ.ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ?
A) DESDYANI B) RISAT
C) NISAR D) RADARSAT

23. ભારતમાં વપરાશ માટે પરમાણું શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ?
A) ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ
B) ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ
C) સ્ટ્રેટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ
D) આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ

24. તામિલનાડુમાં કૂડનકુલમ પરમાણું ઊર્જા પ્લાન્ટ .... સાથેના સહયોગથી બંધાયેલો છે.
A) ROSATOM B) વેસ્ટીંગ હાઉસ
C) તોશિબા D) અરેવા

25. સ્થાનિક અને બહુપક્ષીય માળખામાં નિ:શસ્ત્રીકરણ, બિન-પ્રસાર બાબતો, આત્મવિશ્વાસ અને સુરક્ષા નિર્માણના ઉપાયને લગતી બાબતો વિદેશી બાબતોના મંત્રાલયના (મિનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ-MEA) કયા વિભાગને લગતું છે ?
A) D & ISA વિભાગ B) E & SA વિભાગ
C) XPD વિભાગ D) UNP વિભાગ

26. ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે ?
A) GSAT-7 B) GSAT-9
C) MSAT-1 D) CARTOSAT

27. નીચેના પૈકી ભારતની પ્રથમ (Multi-wavelenght space observatory) કઈ હતી ?
A) માર્સ ઓરબીટર મીશન (MOM)
B) ચંદ્રાયાન - 1
C) એસ્ટ્રોસેટ (ASTROSAT)
D) આદિત્ય - L1

28. "મેઘા-ટ્રોપિક્સ" (Megha-Tropiques) એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઈટ પ્રોજેક્ટ છે ?
A) ભારત અને યુ.એસ.એ. B) ભારત અને રશિયા
C) ભારત અને જાપાન D) ભારત અને ફ્રાન્સ

29. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1) તે બેલેસ્ટીક રક્ષા સંચાલન પ્રણાલી છે.
2) તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે.
3) તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે.
4) તે સેનાને સુપ્રત કરવામાં આવી છે.
A) ફક્ત 1, 3 અને 4 B) ફક્ત 1 અને 4
C) ફક્ત 2, 3 અને 4 D) ફક્ત 2 અને 4

30. હાલમાં પરમાણું પૂરવઠો આપનાર જૂથના (Nuclear Suppliers Group)માં કેટલા દેશો સભ્ય છે ?
A) 32 B) 44 C) 20 D) 48

31. તાજેતરમાં યુ.એસ.એ. એ અફઘાનિસ્તાનના .... પ્રદેશ ઉપર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ' (GBU-43/B) નાખ્યો.
A) બામયન B) ઘોર C) કાપીસા D) નંગરહાર

GPSC MAINS પેપર - 2 - 2016

32. ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઊર્જા સંચાલિત ડ્રોનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી છે. તેને શું કહેવાય છે ?
A) તુસ્કર (Tuskar) B) સેક્વિઅર (Sequir)
C) એકિલ (Aquila) D) પ્રુવર (Prover)

33. નીચેના પૈકી કયા શહેરે ન્યુક્લિયર સિક્યુરીટી સમીટની યજમાની બે વખત કરી છે ?
A) સીયોલ B) ધ હેગ
C) જીનીવા D) વોશિંગ્ટન ડી.સી.

34. ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રીમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે?
A) આર્યભટ્ટ -1 B) ભાસ્કર-1
C) આર્યભટ્ટ D) ભાસ્કર

17)B, 18)B, 19)C, 20)D, 21)A, 22)C, 23)B, 24)A, 25)A, 26)A, 27)C, 28)D, 29)C, 30)D, 31)D, 32)C, 33)D, 34)B.

35. નીતિ આયોગ (NITI Aayog)ની વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ મુજબ ક્યા વર્ષ સુધીમાં 175 GW પુનઃ પ્રાપ્ય ઊર્જા મેળવવાનો ભારતનો લક્ષ્યાંક છે ?
A) 2020 B) 2022 C) 2025 D) 2030

36. ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડિશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલીસ્કોપ (The Giant Meterwave Radio Telescope) ભારતના ક્યા સ્થળે મૂકવામાં આવ્યું છે ?
A) બેંગલોર B) મૈસુર
C) કોડાઈકેનાલ, તમિલનાડુ D) નારાયણગાંવ પુના

37. ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and Forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ?
A) નાગ B) અર્જુન C) બરાક-8 D) ત્રિશૂલ

38. ઈન્ડિયન રીજીયોનલ નેવીગેશન સેટેલાઈટ સીસ્ટમ (NAVIC)નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
A) નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન
B) નેશનલ વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન
C) નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન
D) નેવીગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન

39. પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ?
A) અમુલ B) એટોમ્સ પાવર્સ પ્રા. લિ.
C) ગુજરાત ફર્ટીલાઈઝર્સ D) ઉપરનું એકપણ નહી

40. લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO india Project)દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ?
A) પૃથ્વી ઉપરના જળસ્રોત
B) ગુરૂત્વાકર્ષી (Gravitational) તરંગો
C) ખનીજ સ્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર
D) જળવાયું પરિવર્તનની તહેર

41. જૂનો (Juno) અવકાશયાનને નાસા (NASA)એ સફળતાપૂર્વક ક્યાં ગ્રહ ઉપર મોકલ્યું છે ?
A) મંગળ (Mars) B) પ્લુટો (Pluto)
C) ગુરૂ (Jupiter) D) પેન્ડોરા (Pendora)

42. બાહ્યાવકાશમાં (Outrspace) જીવનના અભ્યાસને શું કહે છે ?
A) એન્ડોબાયોલોજી B) એક્સોબાયોલોજી
C) લાઈફોલોજી D) સ્પેસોલોજી

43. મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ મંડળ (Missile Technology Control Regime)માં 35મા સભ્ય તરીકે ક્યા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ?
A) ચીન B) પાકિસ્તાન C) જાપાન D) ભારત

44. 2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઈંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો ક્યો દેશ સહમત થયો છે ?
A) તાઝીકિસ્તાન (Tajikistan) B) ઉઝબેકિસ્તાન (Uzbekistan)
C) કઝાકિસ્તાન (Kazakhastan) D) યુક્રેન (Ukraine)

45. જી.સી.એન.ઈ.પી. (GCNEP) એટલે...
A) ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ
B) ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ
C) જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ
D) જીઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ

46. ભારતના 'માનવ અવકાશ કાર્યક્રમ' (Indian Human Space Programme(HSP)) માટે ક્યા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે ?
A) GSLV-Mk III B) PSLV-XL
C) LVM-3
D) સંપૂર્ણપણે નવો પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે

47. દુરવર્તી શિક્ષણ અને દૂરવર્તી ઉપચાર ઉપરાંત ઈસરો (ISRO) દ્વારા બીજા ક્યો સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ?
A) ગ્રામ પુસ્તકાલય માળખું B) ગ્રામ સંસાધન કેન્દ્ર
C) જળ સંસાધન માહિતી D) પથદર્શક (Navigation) સેવાઓ

48. ક્યો ભારતનો અદ્યતન હવામાન ઉપગ્રહ છે ?
A) INSAT-2 B) IRNSS-H C) INSAT-3DR D) GSAT-6

49. નીચેના પૈકી ક્યું ભારતનું સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે ?
A) અગ્નિ B) પૃથ્વી C) બ્રહ્મોસ D) આકાશ

50. ચંદ્ર માટેના ઈસરો (ISRO)ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે ?
A) ચંદ્રયાન-2 B) ચંદ્રયાન-3
C) રોવર લેન્ડર-2 D) લ્યુનાર મિશન-2

51. સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ?
A) આર્યભટ્ટ B) CARTOSAT C) RISAT D) EDUSAT

52. ઉપગ્રહની કઈ તસ્વીરોનો દુરદર્શન અને સમાચારપત્રો દ્વારા તેમના હવામાન અહેવાલના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ?
A) INSAT-VHRR B) RS-1C/1D
C) CARTOSAT D) RISAT-1

53. 'સ્માઈલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ?
A) પોખરણ-1 પરમાણુ પરીક્ષણ
B) અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
C) અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ
D) પોખરણ-II પરમાણુ પરીક્ષણ

35)B, 36)D, 37)A, 38)C, 39)A, 40)B, 41)C, 42)B, 43)D, 44)C, 45)A, 46)A, 47)B, 48)C, 49)C, 50)A, 51)D, 52)A, 53)A.

54. યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભ છે.
A) ભ્રૂણ પરીક્ષણ B) દયા મૃત્યુ
C) રંગસૂત્ર ઉપચાર (Gene theraphy)
D) ઈન વીટ્રો ફર્ટીલાઈઝેશન (In Vitro Fertilization)

55. ભારતના ક્યા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ?
A) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
B) વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલય
C) જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય
D) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય

56. 1988માં ભારતે ક્યા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે?
A) યુ.એસ.એ. B) ચીન C) પાકિસ્તાન D) રશિયા

57. પરમાણુ અને વિકિરણ સવલતોનું નિયમન અને સુરક્ષાના કાર્યો ભારત સરકારના 1983માં ઊભો કરાયેલો ક્યો વિભાગ કરે છે?
A) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL)
B) એટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)
C) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE)
D) ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર (BARC)

58. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં ક્યા ભારતીય વડાપ્રધાને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ?
A) જવાહરલાલ નેહરુ B) ઈન્દીરા ગાંધી
C) રાજીવ ગાંધી D) આઈ.કે.ગુજરાલ

59. ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી (NCA)ની માર્ગદર્શિકાઓને ક્રિયાન્વન કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે?
A) ઓટોમીક એનર્જી વિભાગ (DAE)
B) ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર (BARC)
C) ભારતીય સેના
D) સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC)

60. ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના ક્યા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ (CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ?
A) અરૂંધતી ઘોષ B) શીવશંકર મેનન
C) શ્યામ શરણ D) લલીત માનસિંગ

61. ભારતે કઈ નીતિ અપનાવી છે ?
A) પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ
B) પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો
C) પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો
D) ઉપરના પૈકી કોઈ નહી

62. હળવા એનેસ્થેટીક (Mild Anasthetic) તરીકે લાફીંગ ગેસ (Laughing gas) તરીકે જાણીતા ક્યા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?
A) સલ્ફર ડાયોક્સાઈડ B) કાર્બન ડાયોક્સાઈડ
C) નાઈટ્રસ ઓક્સાઈડ D) મિથેન

63. રડાર ક્યા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?
A) સોનિક તરંગો (Sonic Waves)
B) અલ્ટ્રાસાઉન્ડ તરંગો (Ultrasound Waves)
C) રેડિયો તરંગો (Radio waves)
D) ઉપરના પૈકી કોઈ નહી

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

64. બ્લુ એર (Blue Air) શું છે ?
A) ઈસરો દ્વારા બનાવયેલ સૌથી હળવો પદાર્થ
B) ઈસરો દ્વારા બનાવાયેલએક પ્રકારનું ઓક્સિજન વાયુનુ કન્ટેઈનર
C) નાસા દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ
D) ઉપરોક્ત એકપણ નહી

65. 4G સેલ ફોનમાં LTE ટેકનોલોજી વપરાય છે. LTE એટલે...
A) Lightening Technology Engineering
B) Long Term Evolution
C) Liberal Technology Evalution
D) Local Technology Evolution

66. ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 ક્યા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ?
A) રશિયા B) ઈઝરાયેલ C) બ્રિટન D) યુ.એસ.એ.

67. ધી નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી ક્યા વર્ષમાં જાહેર કરવામાં આવી ?
A) ઈ.સ.2003 B) ઈ.સ.2010 C) ઈ.સ.2012 D) ઈ.સ.2013

68. ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ?
A) બે B) ત્રણ C) પાંચ D) ચાર

69. ભારત અને પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું આદાન પ્રદાન સૌપ્રથમ ક્યારે થયેલ હતું ?
A) 1-1-1989 B) 1-1-1990 C) 1-1-1991 D) 1-1-1992

70. સંયુક્ત સૈન્ય અભ્યાસ -અભ્યાસ ઈકુવેરિનનું આયોજન ડિસેમ્બર-16માં થયેલ તેમાં ક્યા દેશો સામેલ હતા ?
A) ભારત અને માલદીવ B) ભારત અને બ્રિટન
C) પાકિસ્તાન અને ચીન D) પાકિસ્તાન અને માલદીવ

54)B, 55)B, 56)C, 57)B, 58)C, 59)D, 60)A, 61)C, 62)C, 63)C, 64)A, 65)B, 66)B, 67)D, 68)A, 69)D, 70)A.

કોન્સ્ટેબલ - 2015

71. ભારતે છોડેલું મંગળયાન ક્યા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ?
A) મંગળ B) બુધ C) ગુરૂ D) શુક્ર

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

72. ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઈસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?
A) બેંગલોર B) શ્રીહરિકોટા
C) દિલ્હી D) હૈદરાબાદ

73. ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?
A) કેરળ B) તમિલનાડુ
C) તેલંગાણા D) આંધ્ર પ્રદેશ

GPSC પ્રિલિમ - 2001

74. ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે "અપ્સરા"નો સંબંધ કોની સાથે છે ?
A) કૃત્રિમ ઉપગ્રહ B) મિસાઈલ
C) અણુ રીએક્ટર D) રોકેટ

GPSC પ્રિલિમ - 2007

75. રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું ?
A) એપોલો B) સ્પૂટનિક C) લાયકા D) પ્રાબદા

76. ISRO એટલે શું ?
A) ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઓર્ગેનિઝેશન
B) ઈન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ
C) ઈન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ
D) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનિઝેશન

77. ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે ?
A) બચેન્દ્રી પાલ B) કલ્પના ચાવલા
C) સુનિતા વિલિયમ્સ D) આમાંની કોઈ જ નહીં

GPSC પ્રિલિમ - 2014

78. નીચે દર્શાવેલ સંસ્થાઓ અને તેમનાં સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

સંસ્થા	સ્થળ
A) નેશનલ સેન્ટર પ્લાન્ટ જિનોમ (Genome) રિસર્ચ	- હૈદરાબાદ
B) ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરીસોર્સીઝ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ	- નવી દિલ્હી
C) સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક	- ઈમ્ફાલ
D) નેશનલ બ્રેઈન રિસર્ચ સેન્ટર	- માનેસર

79. પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક (ESCES) ક્યા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ?
A) અમદાવાદ B) પુણે C) મુંબઈ D) નવી દિલ્હી

80. ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ?
A) આઈ.એન.એસ. કોલકાતા
B) આઈ.એન.એસ. વીરશક્તિ
C) આઈ.એન.એસ. વિક્રાંત
D) આઈ.એન.એસ. અરિહંત

81. 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર :
A) એલન શેફર્ડ B) બઝ એલ્ડ્રિન
C) એડગર મિશેલ D) નીલ આર્મસ્ટ્રોન્ગ

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

82. ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર ક્યા નામે ઓળખાય છે?
A) આઈ.એસ.એસ. B) ઈસરો
C) અટીરા D) આઈ.આર.એસ.

PSI/ASI GK - 2/5/2015

83. ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ?
A) પોખરણ B) ચાંદીપુર C) શ્રી હરીકોટા D) થુમ્બા

84. ક્યા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ?
A) ઓપન હાઈમેર B) રોબર્ટ એચ. ગોડાર્ડ
C) ટી.એચ. માઈમેન D) એડવીન એલ્ડ્રીન

71)A, 72)A, 73)D, 74)C, 75)B, 76)D, 77)B, 78)D, 79)A, 80)D, 81)D, 82)B, 83)A, 84)B.

85. ભારતે એન્ટારટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે?
A) ગંગોત્રી અને કરૂણા B) દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
C) વિક્રાંત અને વિક્રમ D) ત્રણેમાંથી એકપણ નહીં

86. ઈન્સા (INSA) શું છે ?
A) આધુનિક રાઈફલ B) સાયન્સ એકેડમી
C) સ્પેશ સટલ D) આમાનું કોઈપણ નહી

87. ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ?
A) ત્રણ મહિના B) બે મહિના
C) એક મહિનો D) ચાર મહિના

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

88. કઈ ભારતીય સંસ્થાને તેના માનવરહિત કોમ્બેટ એરીયલ વ્હીકલ, રૂસ્તમ-2 નું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું?
A) DRDO B) NASA C) NATA D) TATA

GPSC Class - 2 - 18/12/2016

89. તાજેતરમાં લોન્ચ કરાયેલ MR-SAM (Medium Range Surface to Air Missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે?
A) ભારત અને ફ્રાન્સ B) ભારત અને યુ.એસ.એ.
C) ભારત અને યુ.કે. D) ભારત અને ઈઝરાયેલ

90. વિખંડન દરમ્યાન છૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહિ.
A) બેરિલિયમ B) ગ્રેફાઈટ
C) હલકું પાણી (Light Water) D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

91. ભારતીય પરમાણુ કાર્યક્રમ કુલ કેટલા તબક્કાઓ ધરાવે છે?
A) ત્રણ B) ચાર C) બે D) પાંચ

92. ભારતની સ્વદેશ -નિર્મિત પરમાણુ સબમરિન અરિહંત કઈ મિસાઈલ ધરાવે છે.
A) K-15 B) K-12 C) K-4 D) બંને A) અને C)

93. તાપ પ્રેરિત વિદ્યુત-ચૂંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced Electromagnetic Rediation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે?
A) એનેમોમિટર B) કેમોમિટર
C) બોલોમિટર D) ઉપરોક્ત એક પણ નહી

94. ભારતમાં ઈલેક્ટ્રિક ઘરેલું ઉપકરણો અને અન્ય ઉપકરણો માટે સ્ટાર રેટીંગ આપનાર સંસ્થા કઈ ?
A) Bureau of Energy Efficiency -BEE
B) Central Electricity Regulatory Commission - CERC
C) Green Energy Bureau
D) Environment Information Institute

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

95. રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે?
A) પિત્તળના કારખાના માટે B) પરમાણુ શકિત મથક તરીકે
C) તાંબાની ખીણ માટે D) પવનચક્કી માટે

96. જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષામાં કયા દેશ દ્વારા Fengyon - 4 ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે?
A) યુ.એસ B) ફ્રાન્સ C) જાપાન D) ચીન

GPSC Class - 2 - 28/1/2017

97. દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The Defence Research and Development Organisation) દ્વારા કયા મીસાઈલ વિકસાવેલ છે?
A) પૃથ્વી, આકાશ B) ત્રિશૂળ, નાગ
C) અગ્નિ D) ઉપરોક્ત બધા જ

98. અગ્રગણ્ય અંતરીક્ષ સંસ્થાઓ અને તેના કાર્ય મથકને યોગ્ય રીતે જોડવો.

1) VSSC - Vikram sarabhai Space Centre	A) Thiruvananthpuram
2) ISRO - Satellite Centre	B) Bangaluru
3) SAC - Space Application Centre	C) Ahmedabad
4) SHAR Centre	D) Shrihari Kota

A) 1-B, 2-C, 3-D, 4-A B) 1-A, 2-B, 3-C, 4-D
C) 1-C, 2-D, 3-A, 4-B D) 1-D, 2-A, 3-B, 4-C

99. ક્રાયોજીનીક એંજીન (Cryogenic Enginges) નો ઉપયોગ કયા થાય છે?
A) સબમરીન પ્રોપલશન માટે (Sub-Marine Propulsion)
B) રેફ્રીઝરેટર માટે (Refrigerators)
C) રોકેટ ટેકનોલોજી (Rocket Technology)
D) સુપર કંડકટીવીટી (Super Conductivity)

100. The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે?
A) કેનેડા, અમેરિકા B) ચીન, જાપાન
C) ભારત D) ઉપરોક્ત બધા જ દેશો

101. સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
A) ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ
B) સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ
C) માહિતી અને પ્રસારણ મંત્રાલય
D) હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય

85)B, 86)B, 87)D, 88)A, 89)D, 90)D, 91)A, 92)D, 93)C, 94)A, 95)B, 96)D, 97)D, 98)B, 99)C, 100)D, 101)B.

GPSC Class-1 - 15/01/2017

102. નીચે પૈકી કઈ જોડ ખોટી છે?
A)રાવતભાટા-પરમાણુ ઊર્જા મથક - રાજસ્થાન
B) કલ્પક્કમ - પરમાણુ ઊર્જા મથક - તામિલનાડુ
C) કૈગા પરમાણુ ઊર્જા મથક - કર્ણાટક
D)કુડનકુલા - પરમાણુ ઊર્જા મથક - કર્ણાટક

103. ભારતમાં 'મિસાઈલ વૂમન' તરીકે કોણ ઓળખાય છે?
A)અંજૂ નાયક B)કે.થોમ્સ C)ટેસી થોમસ D)કે.સુપામ્બિકા

104. કઈ મિસાઈલને કલામનું નામ આપવામાં આવ્યું છે?
A)અસ્ત્ર B)આકાશ C)ધનુષ D)બ્રહ્મોસ

105. 'અશ્વિન' એ શું છે?
A)પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ
B)એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ
C)ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ
D)એક ઉપગ્રહ

106. સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું?
A)આર્યભટ્ટ B) SLV3
C) રોહિણી D)રોહિણી RS-1

107. ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યાની બાબતમાં કયું રાજય પ્રથમ નંબર પર છે?
A)તમિલનાડુ B)મહારાષ્ટ્ર C)આંધ્રપ્રદેશ D)કર્ણાટક

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

108. મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતાં 2G, 3G અને 4G જેવાં શબ્દોમાં "G" નો અર્થ શું થાય છે ?
A)જનરેશન B) ગ્રેવીટેશન
C) ગ્રાઉન્ડ કવરેજ. D)ગુગલ

109. ઈસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ?
A)19 B)20 C)21 D)22

110. આઈએનએસ (INS) વિક્રાન્ત શું છે ?
A)તોપ B) એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ
C) વિમાનવાહક જહાજ D)સબમરીન

111. ઈન્ફર્મેશન ટેકનોલોજીની રાજધાની ગણાતું "સિલિકોન વેલી" સ્થળ-સંકુલ કયા આવેલું છે ?
A)શિકાગો પાસે B) સાન ફ્રાન્સિસ્કો પાસે
C) ન્યૂયોર્ક પાસે D) ન્યૂ જર્સી પાસે

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

112. તાજેતરમાં ચર્ચામાં રહેલ કલ્પક્કમ પરમાણું પ્લાન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે ?
A) ફ્રાન્સ B) રશિયા
C) અમેરિકા D) ઉપરમાંથી એકપણ નહીં

113. ન્યુક્લિયર ફયુઅલ કોમ્પલેક્ષ કયાં આવેલું છે ?
A)હૈદરાબાદ B)બેંગ્લોર C)મુંબઈ D)જયપુર

114. ઈસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ?
A)સ્ક્રેમસેટ B)સ્ક્રેમજેટ C)સ્પેસ જેટ D)સ્પેસ એક્સ

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

115. રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલપક્કમ (તામિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે?
A)તે પ્રેમાણું ઉર્જાના કેન્દ્રો છે.
B)તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે.
C)તે સૌર ઉર્જાના કેન્દ્રો છે.
D)તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે.

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

116. ભારતનાં પી.એસ.એલ.વી.ની 39મી ઉડાણમાં (PSLV-C37) ભારતનાં બે નેનો ઉપગ્રહની સાથેનાં અન્ય 101 સહયાત્રી ઉપગ્રહ કયા-કયા દેશના હતા?
A)કાઝાકીસ્તાન, ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ
B)ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાન્સ
C)સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાન્સ, યુ.કે
D)યુ.એ.ઈ, યુ.એસ.એ., જાપાન, ફ્રાન્સ, યુ.કે.ઈજિપ્ત

117. નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે?
A)GSAT-18 B) RESOURCE SAT-2A
C) INSAT-3DR D) CARTOSAT-2

118. અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે
A)નીલો B)સફેદ C) કાળો D)કેસરી

102)D, 103)C, 104)D, 105)B, 106)C, 107)B, 108)A, 109)B, 110)C, 111)B, 112)D, 113)A, 114)B, 115)A, 116)A, 117)A, 118)C.

GPSC Class - 2 - 18/03/2017

119. તા. 15 ફેબ્રુઆરી 2017 ના રોજ "ઈસરો " દ્વારા એકી સાથે કેટલાં ઉપગ્રહો તરતા મુકેલ હતા?
A) 102 B) 103 C) 104 D) 105

120. નીચે જણાવેલ સંરક્ષણ સંબંધીત વસ્તુઓ પૈકી કઈ વસ્તુઓ સ્વદેશમાં બનાવવામાં આવે છે?
A) તેજસ B) રડાર ઈમેજીંગ સેટેલાઈટ
C) નાગ - એન્ટી ટેન્ક મિસાઈલ D) અગ્ની - V
A) માત્ર 1 અને 2 B) માત્ર 1, 2 અને 3
C) માત્ર 1, 2, 4 D) 1, 2, 3 અને 4

GPSC Class - 1 - 28/01/2017

121. નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર (NIC) ભારત સરકારના કયાં વિભાગ હેઠળ કાર્યરત છે?
A) ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ
B) ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી
C) ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન
D) ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી

નાયબ ચિટનીશ - 05/02/2017

122. 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો છે ?
A) INSAT - 4 -A B) METSAT
C) CARTOSAT D) EDUSAT

123. DRDO નું પૂરું નામ શું છે ?
A) Defence Research and Development Organisation
B) Defence Rocket and Development Organisation
C) Defence Recruitment and Development Organisation
D) Defence Research and Defence Operations

GPSC Class - 2 - 16/04/2017

124. ભારત દ્વારા પ્રથમ અણુ પરીક્ષણ કરવામાં આવેલ હતુ ત્યારે વડાપ્રધાન કોણ હતા?
A) ગુલઝારીલાલ નંદા B) વી.પી.સિંહ
C) લાલબહાદુર શાસ્ત્રી D) શ્રીમતી ઈંદિરા ગાંધી

125. ISRO દ્વારા સેટેલાઈટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે?
A) અમદાવાદ B) થુમ્બા
C) શ્રીહરી કોટા D) બેંગલુરૂ

126. હાલમાં ભારતમાં કયા શહેરમાં વાયર બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી 1 gbps (1 giga bytes per second) ની ગતીની સગવડ આપવામાં આવનાર છે?
A) મુંબઈ B) કલકત્તા C) ચેન્નાઈ D) હૈદરાબાદ

GPSC Class - 2 - 02/04/2017

127. મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)"ની ઝડપ શું સૂચવે છે ?
A) હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ
B) ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ
C) હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ
D) ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ

128. ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે તે ન્યુક્લિર સપ્લાયર્સ ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું હતું ?
A) વર્ષ 1969 B) વર્ષ 1978 C) વર્ષ 1974 D) વર્ષ 1976

129. રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં "ખંડેરી" શું છે ?
A) કિલ્લો B) સ્વદેશી સબમરીન
C) રોકેટ D) વિદેશી સબમરીન ફ્રીગેટ

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

130. અપ્સરા રીએક્ટર ક્યા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ?
A) યુ.એસ.એ. B) ફ્રાન્સ C) કેનેડા D) યુ.કે.

131. અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે ?
A) ઓડિશા B) કેરળ C) ગુજરાત D) તામલિનાડુ

GPSC Class - 2 - 12/02/2017

132. ફાસ્ટ બ્રીડર રીએક્ટરમાં ઈંધણ તરીકે ....વપરાય છે.
A) યુરેનિયમ પ્લુટોનિયમ
B) યુરેનિયમ પ્લુટોનિયમ ઓક્સાઈડ
C) યુરેનિયમ થોરિયમ આક્સાઈડ
D) ઉપર પૈકી એક પણ નહી

133. "ઓપરેશન શક્તિ" - ન્યૂકલિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા?
A) શ્રી અટલ બિહારી વાજપેયી B) શ્રી આઈ.કે. ગુજરાલ
C) શ્રી એચ.ડી. દેવગોવડા D) શ્રી પી.વી.નરસિંહરાવ

119)C, 120)D, 121)D, 122)A, 123)A, 124)D, 125)D, 126)D, 127)D, 128)C, 129)B, 130)D, 131)A, 132)B, 133)A.

134. ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ.......... છે.

A) આઈ.એન.એસ.અરિહંત B) આઈ.એન.એસ.વિક્રાંત C) આઈ.એન.એસ.તેજસ D) આઈ.એન.એસ.વિરાટ

GPSC Class - 1 - 09/04/2017

135. ફાસ્ટ બ્રીડર રીએક્ટર (Fast breeder Reactor)માં "ફાસ્ટ-ઝડપી" શબ્દ શું સૂચવે છે ?

A) રીએક્ટરની ઝડપ B) ઈંધણ વપરાશી ઝડપ C) વિદ્યુત નિર્માણની ઝડપ D) ન્યુટ્રોનની ગતિ

136. કાર્બન ડાયોક્સાઈડના અવલોકન માટે ટાનસેટ નામના ઉપગ્રહનું સફળ લોન્ચ કરનાર દેશ કયો છે ?

A) જાપાન B) ચીન C) દક્ષિણ કોરીયા D) વિયેટનામ

137. હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ?

A) ભૂજ B) નડાબેટ C) થિરૂવનંથપુરમ્ D) રામેશ્વરમ્

138. "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ?

A) મિસાઈલ B) રડાર C) લડાકુ વિમાન D) સબમરીન

GPSC Class - 2 - 04/03/2017

139. નીચે પૈકી કઈ રોકેટ ટેક્નોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ?

A) સ્ક્રેમજેટ ટેક્નોલોજી B) રેમજેટ ટેક્નોલોજી C) બેલિસ્ટિક ટેક્નોલોજી D) કાયોજેનિક ટેક્નોલોજી

140. 'પ્રદ્યુમ્ન' એ શું છે ?

A) પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ

B) એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ

C) ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ

D) એક ઉપગ્રહ

141. સ્માર્ટ મોબાઈલ ફોન પ્રોસેસર અને તેને બનાવનાર મૂળ કંપનીની નીચે આપેલ જોડ પૈકી કઈ ખોટી છે ?

A) Snapdragon Processor - Quacomm

B) Apple T Processor - Apple

C) Atom Processor - Intel

D) Tegra K1 Processor - Nvidia

142. કેસ્સિનિ-હ્યુજિન્સ (Cassini Huygens) સ્પેશક્રાફ્ટ કયા ગ્રહની કક્ષામાં પ્રવેશનાર પ્રથમ સ્પેશક્રાફ્ટ છે ?

A) બુધ B) શનિ C) મંગળ D) શુક્ર

143. નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઈડ્રો ઈલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

A) ડૉ. એસ. આર. સુબ્રમણ્યમ B) ડૉ. એસ. આર. રાણા C) ડૉ. આર.કે. કોટનાલા D) ડૉ. આર.કે. કટવાલ

GPSC Class - 2 - 18/03/2017

144. રૂસ્તમ શું છે ?

A) માનવરહિત વાયુયાન B) મિસાઈલ C) અવકાશયાન D) ઉપગ્રહ

145. ઈ-એચ. આર્મસ્ટ્રોંગ શાના માટે વિખ્યાત છે ?

A) ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ તરીકે

B) તેમણે લોન્ચ વેહિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા.

C) વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.

D) ફ્રિક્વન્સી મોડ્યુલેશન રેડિયોના શોધક તરીકે

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

146. કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ મીશન તરીકે કોણ ઓળખાય છે?

A) પીએસએલવી-સી 34 B) પીએસએલવી-સી 30 C) એરિયન-5 વીએ -227 D) એરિયન -5

147. અણુબૉંબમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઈસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ?

A) 92 U 235 B) 92 U 233 C) 92 U 238 D) 92 U 234

GPSC Class - 2 - 5/3/2017

148. "સતીષ ધવન સ્પેસ સેન્ટર" ક્યાં રાજ્યમાં આવેલું છે ? (SDSC)

A) ગુજરાત B) આંધ્ર પ્રદેશ C) તામીલનાડુ D) ઉત્તરાખંડ

GPSC Class - 2 - 11/12/2016

149. ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ?

A) શ્રીસ્ટી B) કાવેરી C) ક્રિષ્ના D) મોહિની

GPSC Class - 2 - 05/02/2017

150. ભારતમાં 'નેશનલ સાયબર સિક્યોરીટી' માટે કઈ નીતિ સંબંધિત છે?

A) નેશનલ સાયબર સિક્યોરીટી પોલીસી, 2013

B) નેશનલ સાયબર સિક્યોરીટી પોલીસી, 2014

C) નેશનલ સાયબર સિક્યોરીટી પોલીસી, 2015

D) નેશનલ સાયબર સિક્યોરીટી પોલીસી, 2016

134)A, 135)D, 136)B, 137)C, 138)A, 139)D, 140)A, 141)B, 142)B, 143)C, 144)A, 145)D, 146)A, 147)C, 148)B, 149)B, 150)A.

151. "હિમાદ્રી સ્ટેશન" ક્યાં આવેલ છે?
A) એન્ટાર્કટિકા B) સિયાચીન C) આર્કટિક પ્રદેશ D) સિમલા
152. પોખરણ - 1 નો કોડ શું હતો?
A) બ્લેક બોમ્બ B) ડિસ્ટ્રક્શન
C) બ્લુ આઈઝ D) સ્માઈલીંગ બુદ્ધા
153. GIS નું આખું નામ શું છે?
A) Ganga Information System B) Geographic Information System
C) General Integrated System
D) Geographically Integrated System
154. જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા?
A) 12 B) 16 C) 15 D) 20
155. ચાશ્મા-3 (Chasma-III) એ કયા દેશનો આણ્વિક પ્લાન્ટ છે?
A) ચીન B) જાપાન C) દ.કોરિયા D) પાકિસ્તાન
156. ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રયુદ્ધના અભ્યાસ માટે 'કોંકણ - 16' શરૂ કરવામાં આવ્યું?
A) અમેરિકા B) શ્રીલંકા C) બ્રિટન D) રશિયા

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

157. વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું.
A) ચીન B) યુ.એસ.એ C) જાપાન D) ભારત
158. ચન્દ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે?
A) ચાર્લ્સ ડ્યુક B) એડગર મિશેલ
C) એલન બીન D) નીલ આર્મસ્ટ્રોંગ
159. ભારતમાં નીર્મિત વિશ્વસ્તરનું હલકું લડાયક વિમાન નીચે પૈકી કયું છે?
A) તરંગ B) તેજસ C) દિષ્ટ દષ્ટિ D) આકાશ
160. IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો?
A) ભારત B) બ્રાઝિલ C) દક્ષિણ આફ્રિકા D) માલદિવ્સ
161. પ્રોજેક્ટ-પી-751 (Project-P-751) શાને સંબંધિત છે?
A) સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ
B) આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ
C) અગ્નિ-6 મિસાઈલના વિકાસ માટેનો પ્રોજેક્ટ
D) સ્વદેશી એરક્રાફ્ટ કેરીયર બનાવવા માટેનો પ્રોજેક્ટ
162. ફેબ્રુઆરી 2017માં ઈસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે, તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા?
A) અમેરિકા અને ઈઝરાયેલ
B) અમેરિકા, ઈઝરાયેલ અને કઝાખસ્તાન
C) ધી નેધરલેન્ડ, સ્વીટરઝલેન્ડ અને યુએઈ
D) (A) થી (C) માં દર્શાવેલ બધા જ દેશોના

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

163. 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ?
A) શંકરાચાર્ય B) આર્યભટ્ટ C) વ્યાસ D) રોહિણી
164. તાજેતરમાં માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ?
A) 84 B) 90 C) 101 D) 104

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

165. ઉપગ્રહ છોડવામા માટેના લોન્ચ વેહિકલમાં Scarmjet ટેક્નોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પૂરું નામ નીચે પૈકી કયું છે?
A) Subsonic Combusting Ramjet
B) Supersonic Combusting Ramjet
C) Subsonic Computer based Ramjet
D) ઉપર પૈકી એક પણ નહી.
166. ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે?
A) 2500 કિમી B) 4000 કિમી
C) 4500 કિમી D) 5000 કિમી અને તેથી પણ વધુ

મુખ્ય સેવિકા - 8/1/2017

167. ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ?
A) વિક્રમાદિત્ય B) વિરાટ
C) વિભૂતિ D) અરિહંત

ચીફ ઓફિસર - 1999

168. ક્યા વૈજ્ઞાનિકે ભારતને અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો હતો ?
- વિક્રમ સારાભાઈ
169. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ક્યા આવેલી છે
- અમદાવાદ
170. પોખરણના અણુધડાકા સાથે ક્યા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? - અબ્દુલ કલામ

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

171. ઈસરો દ્વારા વર્ષ 2017માં 104 ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરી, સૌથી વધારે સેટેલાઈટ પ્રક્ષેપિત કરવાનો રેકર્ડ બનાવ્યો, આ ઉપગ્રહો ક્યા યાનની મદદથી પ્રક્ષેપિત કરાયા હતા ? :
PSLV C-37

151)C, 152)D, 153)B, 154)D, 155)D, 156)C, 157)C, 158)A, 159)B, 160)D, 161)B, 162)D, 163)B, 164)D, 165)B, 166)D, 167)C.

172. ભારતની નેશનલ ડિજિટલ લાઈબ્રેરીના સંદર્ભમાં કઈ IIT દ્વારા વિકસાવાયેલ સીંગલ વીન્ડોની શોધ સગવડ સાથે શીખવાના સ્ત્રોતોની વર્ચ્યુઅલ રિપોઝીટરી છે ?
- ખડગપુર

173. ભારતીય પ્રાદેશિક નૌચાલન માટે કેટલા ઉપગ્રહોની જરૂર પડશે? - **7**

174. તમામ શૈક્ષણિક સ્તરોને આધાર પૂરો પાડવા માટે.........ગોઠવવામાં આવેલ છે ? - **નેશનલ ડિજિટલ લાઈબ્રેરી**

175. બરાક સરફેસ ટુ એર મિસાઈલ ક્યા દેશ દ્વારા બનાવવામાં આવેલી છે ? - **ઈઝરાયેલ**

176. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો પ્રથમ ભાગ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ? - **1998**

177. IRNSS કઈ બાબતની સચોટ માહિતી પૂરી પાડશે ? - **સ્થિતિ/સ્થાન**

178. લેસર સંદર્ભે એક તરંગ લંબાઈવાળા પ્રકાશને શું કહેવાય ? - **મોનોક્રમેટિક લાઈટ**

179. DRDO દ્વારા વિકસાવાયેલા ક્યા પ્રકારના વિમાનને નિશાંત નામ આપવામાં આવ્યું છે ? - **અનમેન એરિયલ વ્હિકલ (UAV)**

180. DRDO દ્વારા લદાખમાં વિશ્વનું સૌથી ઊંચું ટેરેસ્ટ્રીયલ કેન્દ્ર ઊભું કરવા પાછળનો આશય શું છે ? - **દુર્લભ અને વિલુપ્તીના આરે પહોંચેલી ઔષધીય વનસ્પતિનું સંરક્ષણ કરવું**

181. ચંદ્રની સપાટીથી ઉપર ચંદ્રયાન-1 ઉપગ્રહની ભ્રમણકક્ષાની ઊંચાઈ કેટલી છે ? - **200 કિમી**

182. GPS આધરિત જીઓ ઓગમેન્ટેડ નેવીગેશન કાર્યક્રમ (GAGAN)નો પ્રાથમિક ધ્યેય શું છે ? - **નાગરિક ઉડ્ડયન માટે ઉપગ્રહ આધારિત ઓગમેન્ટેશન સિસ્ટમની સ્થાપના, ઉપયોગ અને પ્રમાણિત કરવું**

183. પૃથ્વી-IIIની 350 કિ.મી.ની પહોંચ મર્યાદાવાળી નૌકાદળીય આવૃત્તિને ....કહે છે. - **ધનુષ**

184. યેલો કેક કઈ બાબત સાથે સંકળાયેલ છે ? - **ન્યૂક્લિયર રિએક્ટરનું બળતણ**

185. ભારતે કઈ ટ્રીટીમાં સહી કરી છે ? - **પાર્શીયલ ટેસ્ટ બેન ટ્રીટી (PTBT)**

186. NPT સંધિ અન્વયે પરમાણુ હથિયારોએ ક્યા દેશો માટેનો વિશેષાધિકાર બની ગયો છે ? - **P-5**

187. બ્યુફોર્ટ સ્કેલનો ઉપયોગ..............માપક અને નોંધણી માટે થાય છે. - **પવનની શક્તિના**

188. પૃથ્વીનું રિમોટ સેન્સિંગ કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ? - **ઈસરો**

189. કૃત્રિમ બિયારણ એટલે શું ? - **જેલ(GEL)માં પ્રવૃત્ત શારીરિક ગર્ભ**

190. કઈ સંધિ અન્વયે જે દેશોએ 1 જાન્યુઆરી, 1967 પહેલા પરમાણુ બોંબ પરીક્ષણ કરેલ હોય તેવા દેશોને પરમાણુ શસ્ત્ર દેશ તરીકે મનસ્વીપણે નક્કી કરી દીધા છે ? - **ન્યુક્લિયર નોન પ્રોલીફીરેશન ટ્રીટી**

191. નિર્ભયા મિસાઈલ કેટલા કિલોગ્રામ શસ્ત્રો કે યુદ્ધ સામગ્રીનું વહન કરે છે ? - **300 કિલોગ્રામ**

192. બ્લૂ એર શું છે ? - **ઈસરો દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ**

193. 2006નો હેનરી જે.હાઈડ એક્ટ ક્યા દ્વિપક્ષીય સહકાર સંદર્ભે છે ? - **અમેરિકા-ભારત સિવિલ ન્યુક્લિયર સહકાર**

194. ભારતની પ્રથમ પરમાણુ સંચાલિત પનડુબ્બી અરિહંત.........- **સ્વદેશી બનાવટની છે.**

195. ભારત ન્યુક્લિયર નોન પ્રોલિફિરેશન ટ્રીટી (NPT)ને ક્યા કારણથી ભેદભાવયુક્ત સંધિ સમજે છે ? - **પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે સમયબદ્ધ અને ચકાસણીપાત્ર પ્રતિબદ્ધતાના ઉલ્લેખનો અભાવ**

196. ફાસ્ટ ન્યુક્લિયર રિએક્ટરમાં ક્યું શીતક (કુલન્ટ) તરીકે વાપરી શકાય ? - **પ્રવાહી સોડિયમ**

197. IRNSS ભારત તેમજ તેની હદ રેખાથી કેટલા કિ.મી. સુધીના વિસ્તારના વપરાશકર્તાઓને સેવા પૂરી પાડશે ? - **1500 કિ.મી.**

198. જાપાનની સ્પેસ એજન્સી અને સ્થળ જણાવો. - **JAXA તાનેશિમા**

199. લેસર સંદર્ભે પારજાંબલી પ્રકાશને શું કહેવાય ? - **યુ વી લાઈટ**

200. સાયબર સીક્યુરિટી/સુરક્ષાની પરિભાષામાં DOS એટલે ? - **ડિનાયલ ઓફ સર્વિસ**

201. કેસ્સલર સિન્ડ્રોમ શું છે ? - **અવકાશનો કાટમાળ ટકરાવવાની એક કાલ્પનિક અને ભયાનક અવકાશી ઘટનાનો વિચાર**

202. અવકાશ ઉપલબ્ધી માટે રોકેટરી કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ? - **ઈસરો**

203. GIS એપ્લિકેશન પ્રોગ્રામ ભૂમિગત જળ અને અન્ય કુદરતી સંસાધનો, દરિયાકિનારાના વિસ્તારોની માહિતી વગેરે એકત્ર કરવા માટેની રાજ્ય સરકારની સંસ્થા કઈ છે ? - **ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઈન્ફર્મેટિક્સ**

204. કોણે વિશ્વના સૌથી નાના સર્જીકલ રોબોટ 'વર્સીયસ'ની રચના કરી ? - **બ્રિટિશ વૈજ્ઞાનિકો**

205. લેસર સંદર્ભે પારરક્ત પ્રકાશને શું કહેવાય ? - **ઈન્ફ્રા રેડ લાઈટ**

206. ચંદ્રની સપાટી ઉપર પાણીના પરમાણુઓની શોધનો શ્રેય ક્યા દેશને મળે છે ? - **ભારત**

207. ક્યા પ્રોજેક્ટથી ભારતમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેની સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે ? - **IndiGo પ્રોજેક્ટ**

208. કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રત્યારોપણ થઈ શકે તેવા જૈવ કૃત્રિમ સ્વાદુપિંડની રચના કરી છે ? - **આઈ.આઈ.ટી. ગુવાહાટી**

209. અમેરિકાની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો. - **NASA-ઓરલેન્ડો**

210. TFT, TFD, OLED, AMOLED, CAPACITIVE કઈ બાબતના પ્રકાર છે ? - **સ્માર્ટફોન ડિસ્પ્લેના**

211. બ્લુ રે ડિસ્ક DVD કરતા વધુ મેમરી સંગ્રહિત કરે છે, આ વિધાન - **સત્ય છે**

212. નેશનલ એરોનોટિક્સ લેબોરેટરીઝ બેંગલોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ? - **FLO SOLVER**

213. ભારતે કેટલામા પ્રયત્ને મંગળ ઉપર સફળ મિશન કર્યું ? - **પ્રથમ**

214. અમેરિકાની નાસા દ્વારા કરવામાં આવેલો સેફાયર પ્રયોગ શાના અંગેનો હતો ? - **અંતરિક્ષમાં અગ્નિના અસ્તિત્વ અને રૂપ અંગે**

215. કુડનકુલમ રિએક્ટર પ્લાન્ટ ક્યા દેશના સહયોગથી આકાર પામ્યો છે ? - **રશિયા**

216. IndiGO પ્રોજેક્ટ અન્વયે કઈ લેબ સ્થપાશે ? - **ગ્રેવિટેશનલ વેવ્સ ઓબ્જર્વેશન લેબ**

217. યુરોપની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો. - **ESA-ફ્રેન્ચ ગુયાના**

218. ચંદ્રશેખર લિમિટ શાને સંબંધિત છે ? - **ક્યો તારો વ્હાઈટ ડ્વાર્ફ બનશે અને ક્યો તારો સુપરનોવા બનશે તે અંગેની તારાના દળની મર્યાદા**

219. IndiGO પ્રોજેક્ટ હેઠળ ભારત માટેનું ગ્રેવિટેશનલ વેવ્સ એડવાન્સ્ડ ડિટેક્ટર ક્યાથી સ્થળાંતરિત કરવામાં આવશે ? - **હેન્ફોર્ડ, અમેરિકા**

220. USB (યુનિવર્સલ સીરિયલ બસ)ના સહશોધકર્તા તરીકે મૂળ ગુજરાતી .... છે. - **અજય ભટ્ટ**

221. જૈતાપુર પરમાણુ ઊર્જા પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ પ્રાપ્ત થયો છે ? - **ફ્રાન્સ**

222. દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યો છે ? - **100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ**

223. વ્યાપાર કે અન્ય હેતુ માટે અનિશ્ચિત ઈ-મેઈલ્સ મોકલવાને શું કહેવાય ? - **સ્પામીંગ**

224. 4G સેલફોનમાં LTE ટેક્નોલોજી એટલે... - **Long Term Evolution**

225. ભારતે PSLV-37ની ઉડાન દ્વારા 101 ઉપગ્રહોને કઈ વ્યાપારિક સમજૂતીના ભાગરૂપે મૂકવામાં આવ્યા હતા ? - **અંતરિક્ષ કોર્પોરેશન લી. અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો**

226. કોવાડા પરમાણુ પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ મળ્યો છે ? - **અમેરિકા**

227. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી અગાઉ જાણીતું હતું ? - **DOEACC સોસાયટી**

228. ક્યા રાજ્યના ઉટાકામંડ નજીક નિલગીરીની ટેકરી પર રેડિયો ટેલિસ્કોપ આરે સ્થાપિત કરવામાં આવેલ છે ? - **તમિલનાડુ**

229. ITની ભાષામાં ડેમોન (DEAMON) શબ્દ શા માટે વપરાય છે? - **બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઈન કમ્પ્યૂટર**

230. ઈલુશિન શું છે ? - **પરિવહન વિમાન**

231. હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં વોલેટાઈલ મેમરી સ્ટોર થાય છે, એટલે કે વિદ્યુત શક્તિની ગેરહાજરીમાં ડેટા સ્ટોર થયેલા રહેતા નથી, આ વિધાન - **સત્ય છે**

232. 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરાયેલો છે ? - **NJPC**

233. સુપરસોનીક કમ્બસ્ટીંગ રેમજેટ એન્જિન..............તરીકે પણ ઓળખાય છે.- **સ્ક્રેમજેટ એન્જિન**

234. ઈ-મેઈલ બીજી પ્રપંચી છેતરપિંડીવાળી વેબસાઈટ ઉપર વાળવાને શું કહેવાય છે ? - **ફિશિંગ**

235. 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલો છે ? - **કેરળ**

236. ભારતમાં ક્યું ઉપગ્રહ તંત્ર પ્રમાણભૂત/સામાન્ય સ્થિતિ વિષયક સેવાની સાથે સાથે પ્રતિબંધિત સેવાઓ પણ પૂરી પાડશે ? - **IRNSS**

237. ઈન્ટરનેટ ક્ષેત્રે વિદ્યમાન પ્રખ્યાત ડોમેઈન નામને મળતું આવતું ડોમેઈન નામ ધારણ કરવાને શું કહેવાય છે ? - **ટાઈપો સ્કવેટિંગ**

238. અવિધિસર રીતે ચાલતા ઈન્ફર્મેશન ટેક્નોલોજીના કોર્સને માન્યતા કોણ આપે છે ? - **નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી**

239. ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોમાં વાદળ સફેદ શા કારણે દેખાય છે ? - **વિકિરણ**

240. યુ.આર. રાવને 2016નો IAF હોલ ઓફ ફેમ એવોર્ડ ક્યા ક્ષેત્રની કામગીરી બદલ પ્રાપ્ત થયો ? - **એસ્ટ્રોનોટીક્સ**

241. ન્યુક્લીયર લાયાબિલીટી ફંડ માટે કોની પાસેથી ફંડ માટેના નાણાં ઉઘરાવવામાં આવશે ? - **ન્યુક્લીયર ઓપરેટર પાસેથી**

242. ધી નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી ક્યા વર્ષમાં જાહેર કરવામાં આવી ? - **2013**

243. લક્ષ્ય ક્યા પ્રકારનું વિમાન ગણાય ? - **પાયલોટ વિનાનું લક્ષ્યાંક વિમાન**

244. લાઈમન આલ્ફા ફોટોમીટર, માર્સ કલર કેમેરા, થર્મલ ઈન્ફારેડ ઈમેજિંગ સ્પેક્ટ્રોમીટર વગેરે ક્યા મિશનના ઓન બોર્ડ પેલોડ્સના સાધનો છે ? - **માર્સ ઓર્બિટર મિશન (MOM)**

245. ડી.આર.ડી.ઓ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી હવામાં અગમચેતી આપતા અને નિયંત્રણ કરતા વિમાનનું નામ........છે. - **આઈ ઈન ધ સ્કાય**

246. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી કઈ બાબત અંગેની તાલીમ આપે છે ? - **ઈન્ફર્મેશન ટેક્નોલોજી**

247. સી-17 ગ્લોબમાસ્ટર શું છે ? - **દુનિયાનું સૌથી વિશાળ માલવાહક જહાજ**

248. ક્યા શહેર પાસે નારાયણ ગામમાં જાયન્ટ મીટ્રે વેવ રેડિયો ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવેલ છે ? - **પુણે**

249. ક્લાઉડ સેન્ડીંગમાં મુખ્યત્વે ક્યા રસાયણો વપરાય છે ? - **સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ, ડ્રાઈ આઈસ**

250. ભારતીય રાષ્ટ્રીય સમુદ્રી માહિતી સેવા કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ સરત (SARAT-The search and Rescue Aid Tool) ....છે. - **મોબાઈલ એપ**

251. મોબાઈલ ફોનથી ઉત્સર્જિત વિકિરણ આરોગ્યને નુકસાન ન કરે તે માટેની સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ લિમિટ નક્કી કરાઈ છે. તે અંગે ભારત કઈ સંસ્થાની માર્ગદર્શિકા આધારભૂત ગણે છે ? - **ઈન્ટરનેશનલ કમિશન ઓન નનઆયોડાઈઝિંગ રેડિયેશન પ્રોટેક્શન ગાઈડલાઈન્સ**

252. અઘરકર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ? - **પુણે**

253. નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસિસ કમ્પનીઝ દ્વારા ભારતમાં સૌપ્રથમ ધ સેન્ટર ઓફ એક્સલન્સ ફોક્સ્ડ ઓન ઈન્ટરનેટ ઓફ થીંગ્સ ક્યા સ્થળે સ્થાપવામાં આવેલ છે ? - **બેંગલુરુ**

254. નવા જન્મેલા બાળકોના મૃત્યુ અટકાવવા યુનિસેફ દ્વારા ક્યો કાર્યક્રમ શરૂ કરાયો છે ? - **એવરી ચાઈલ્ડ અલાઈવ**

255. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ક્યા આવેલું છે ? - **મુંબઈ**

256. સ્માર્ટ મોબાઈલ ફોનનાં વાયરલેસ ચાર્જીંગ માટે વર્તમાન સમયે કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે ? - **ઈન્ડક્ટીવ પાવર ટ્રાન્સફર**

257. તે અત્યંત ઈંધણ કાર્યક્ષમ છે, કોર્સ કરેક્શન કાર્યવાહી દરમિયાન અને લિફ્ટ ઓફ ફેઝ દરમિયાન માત્ર ઈંધણની આવશ્યકતાઓ છે. - **બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્રમાં**

258. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ? - **ચેન્નાઈ**

259. દુશ્મની એન્ટીશિપ મિસાઈલોને ગેરમાર્ગે દોરવા ભારતીય નૌસેનાએ કઈ સિસ્ટમ ખરીદી છે ? - **કવચ નવલ ડેકોય સિસ્ટમ**

260. ભારતમાં સૌપ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચ (Space Research)ની સ્થાપના ક્યા નામથી કરવામાં આવી હતી ? - **ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ**

261. ડી.આર.ડી.ઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઈલની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે ? - **અગ્નિ**

262. નિર્ભયા ક્યા પ્રકારની લાંબા અંતરની મિસાઈલ ગણાય ? - **સબસોનિક ક્રુઝ મિસાઈલ**

263. રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRPનું પૂરું નામ જણાવો. - **ઈન્ટરનેશનલ કમિશન ઓફ ધી રેડિયોલોજી પ્રોટેક્શન**

264. ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની અંતરથી અંતર કેટલા કિ.મી. છે ? - **34786**

265. વપરાશ કરે એના કરતા વધુ બળતણ પેદા કરતા પ્રતિક્રિયાકારકને (રિએક્ટરને) શું કહેવાય છે ? - **સંવર્ધક પ્રતિક્રિયાકારક**

266. ભારત પાસે થોરીયમની વિશાળ અનામત છે. આ થોરિયમને ક્યા સ્વરૂપમાં મેળવવામાં આવે છે ? - **દરિયાઈ રેતીના મહત્વના સાંદ્રણ સ્વરૂપે**

267. ડી.આર.ડી.ઓ દ્વારા સેના અને વાયુદળ માટે વિકસાવવામાં આવેલ ઉચ્ચ ક્ષમતાવાળા રડારને ....કહે છે. - **ઈન્દ્ર**

268. સ્ટીલ્થ (stealth) ટેક્નોલોજીમાં (ગુપ્તતા પ્રૌદ્યોગિકીમાં) કઈ બાબતનો સમાવેશ થાય છે ? - **સપાટી ઓછી દૃશ્યમાન થાય તે માટે રંગનો થર કરવામાં આવે છે, આકૃતિમાં ફેરફાર, જેથી રડારમાંથી કિરણો પ્રતિબિંબિત થાય, ખાસ નિર્માણ સામગ્રી વપરાય છે જે સપાટીને ઓછી દૃશ્યમાન બનાવે છે.**

269. ગ્રફીન એટલે શું ? - **કાર્બનના એક અણુની જાડી ફલક**

270. ઈન્ટરનેટ ક્ષેત્રે ખાનગી માહિતીમાં અનઅધિકૃત પ્રવેશને શું કહેવાય ? - **હેકિંગ**

271. ઈસરોના સંચાર ઉપગ્રહના પુરોગામી પ્રાયોગિક ઉપગ્રહનું નામ........છે. - **એપલ (APPLE)**

272. બ્લૂ ટૂથમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ છે ? - **આવર્તન પ્લુતિ પ્રસર વર્ણપટ (Frequency hopping spread spectrum)**

273. ભારત અને ફ્રાન્સ વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહેલો 'રાફેલ સોદો' કોની ખરીદી અંગેનો છે ? - **એરક્રાફ્ટ**

274. બીટી -પાક શું ધરાવે છે ? - **ક્રાયજનીન**

275. ....નો સામુહિક વિનાશના શસ્ત્રોમાં સમાવેશ થાય છે. - **પરમાણુ, રાસાયણિક અને જૈવિક શસ્ત્રો**

276. ભારત-યુ.એસ. નાગરિક પરમાણુ કરાર હેઠળ. - **ભારતના ભવિષ્યમાં પરમાણુ પરિક્ષણ કરવાના હક્કને, ભારતના ત્રણ તબક્કાના સ્વદેશી પરમાણુ કાર્યક્રમને અસર થતી નથી અને ભારતે તેના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમને પડતો મૂકવાનો નથી.**

277. સીબેડ રેસિડેન્ટ ઈવેંટ પ્રોફાઈલર........... દ્વારા વિકસાવવામાં આવ્યો છે.- **રાષ્ટ્રીય સમુદ્રી વિજ્ઞાન સંસ્થા**

278. ક્યો ભારતીય રિએક્ટર વિશ્વનો એકમાત્ર રિએક્ટર છે જ્યાં તમામ ત્રણ ફિસાઈલ આઈસોટોપ, એટલે કે U-235, Pu-239 અને U-233 ઈંધણ તરીકે વપરાય છે ? - **કલ્પક્કમ**

279. પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનમાં પ્લુટોનીયમનું ક્યું આઈસોટોપ વપરાય છે ? - **Pu 239**

280. ભારતની પ્રથમ સ્વદેશી બનાવટ અને વિકસિત લાંબા અંતરની સબસોનિક ક્રુઝ મિસાઈલ કઈ છે ? - **નિર્ભયા**

281. ભારતમાં ફાસ્ટ બ્રીડર (FBR)ના નિર્માણ અને કાર્યરત કરવાનું DAE હેઠળ કઈ ભારતીય કંપનીને સોંપાયું છે ? - **ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિ. (BHAVINI)**

282. વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી એક્સ-રે લેઝર યુરોપીયન એક્સ-રે ફ્રી ઈલેક્ટ્રો લેસરનું અનાવરણ..........શહેરમાં થયું. - **હેમ્બર્ગ, જર્મની**

283. ડીઆરડીઓ (DRDO) દ્વારા વિકસાવાયેલ ક્યું માનવરહિત હવાઈ વાહન (UAV) લક્ષ્યાંક ડ્રોન છે ? - **અભ્યાસ, ઉલ્કા અને લક્ષ્ય**

284. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં.... સભ્યો છે. - **પંદર**

285. ભારત દેશનો સૌપ્રથમ ઉપગ્રહ તૈયાર કરનાર વૈજ્ઞાનિકનું નામ બતાવો. - **યુ.આર. રાવ**

286. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કમ્પ્યૂટર........ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. - **હેવલેટ પેકાર્ડ**

287. નેવીગેશન હેતુઓ માટે સામાન્ય રીતે........નો અધિકૃત માહિતી તરીકે ઉપયોગ થાય છે. - **ટાઈડલ ડેટમ**

288. 'બલસ્ય મુલં વિજ્ઞાનેમ્' મંત્ર કઈ સંસ્થાનો છે ? - **ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન**

289. ભારતની નવી એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમની ડિઝાઈન બનાવી વિકસાવવાનું કાર્ય કોણે કર્યું છે ? - **DRDOની નોડલ પ્રયોગશાળા આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE)**

290. બ્રેક્ઝિટ એ ...... લગતનું બ્રિટિશનું બહાર નીકળવાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. - **યુરોપિયન સમુદાય છોડવાનો યુ.કે.નો નિર્ણય**

291. નાગ, ત્રિશૂલ, પિછોરા અને બરાક એ શું છે ? - **મિસાઈલ**

292. SAR, SLAR અને અલ્ટીમીટર ક્યા પ્રકારના સેન્સર છે ? - **સૂક્ષ્મ તરંગ સેન્સર**

293. VIRUS એટલે શું ? - **વાઈટલ ઈન્ફર્મેશન રિસોર્સ અન્ડર સીઝ**

294. ખેતી વિષયક વિજ્ઞાન, પ્રક્ષેપાત્ર (મિસાઈલ) અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાં સંરક્ષણ તકનિકી વિકાસ કરતી સંસ્થા કઈ છે ? - **DRDO**

295. ભારતનો પ્રથમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ક્યા સ્થપાયો હતો ? - **તારાપોર**

296. એક જ મિશનમાં સૌથી વધુ ઉપગ્રહો મુકનાર પ્રથમ એશિયાઈ દેશ ક્યો છે ? - **ભારત**

297. ટીવી પ્રસારણ સહિતનું ઉપગ્રહ સંદેશાવ્યવહાર કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ? - **ઈસરો**

298. ડીડી ન્યૂઝ ચેનલ હાલ કેટલી ભાષામાં સમાચાર પ્રસારિત કરે છે ? - **ચાર**

299. જેગુઆર ક્યા પ્રકારનું લડાકુ વિમાન ગણાય ? - **જમીની હુમલાનું**

300. જૈતાપુર ખાતે ન્યુક્લિયર રીએક્ટરનું નિર્માણ કરવા સારું ભારતે ક્યા દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે ? - **ફ્રાન્સ**

301. નેશનલ એટમોસ્ફીયરિક રિસર્ચ લેબોરેટરી (NARL) ક્યા આવેલી છે ? - **તીરુપતિ**

302. ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ધનુષ મિસાઈલ......... મિસાઈલનો પ્રકાર છે. - **પૃથ્વી**

303. સાર્કના પ્રાદેશિક જૂથમાં કેટલા સભ્યો છે ? - **આઠ**

304. INS ચક્ર શું છે ? - **પરમાણુ સબમરીન**

305. નિર્ભયા મિસાઈલની કાર્યન્વિત રેન્જ કેટલા કિ.મી. છે ? - **1000 કિ.મી.**

ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ અને પ્રોજેક્ટો

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે 'કૃષિ અને સહકાર વિભાગ'નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ?
   A) કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ
   B) કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ
   C) ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ
   D) કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ
2. અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ?
   A) પ્રધાનમંત્રી પાક બીમા યોજના
   B) પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના
   C) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
   D) પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના
3. ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
   A) ધીરૂભાઈ શાહ B) સનત મહેતા
   C) જશવંત મહેતા D) વિનય શર્મા
4. 'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવેલ છે ?
   A) 1996 B) 1998 C) 1994 D) 1999
5. ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?
   A) 1993-98 B) 2000-05 C) 2002-07 D) 1995-2000
6. ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ?
   A) 1969 B) 1963 C) 1967 D) 1965
7. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ?
   A) સંજેલી તાલુકો B) ગરબાડા તાલુકો
   C) ઝાલોદ તાલુકો D) ધાનપુર તાલુકો

રેવન્યૂ તલાટી - 28/02/2016

8. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સીંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ?
   A) કુટીર જયોતિ યોજના
   B) ગ્રામ/શહેર આવાસ વીજ યોજના
   C) ખુશી યોજના
   D) ઝૂંપડા વીજળીકરણ યોજના
9. ગતિશીલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'મેટ્રો રેલ'નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ?
   A) મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ.
   B) મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ.
   C) મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ.
   D) મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ.
10. રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા/વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.
   A) મહાવીર જીવદયા એવોર્ડ
   B) મહાવીર સ્વામી પુરસ્કાર યોજના
   C) મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ
   D) મહાવીર એવોર્ડ
11. તાજેતરમાં 'ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?
   A) ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ
   B) શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ
   C) શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ
   D) ધન્વન્તરી આરોગ્ય રથ

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

12. 'ઈ વોલેટ'યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ?
   A) એસ.બી.આઈ B) જી.સી.ઈ.આર.ટી
   C) આઈ.આર.સી.ટી.સી D) આઈ.સેફ.સી

1)A, 2)C, 3)C, 4)A, 5)D, 6)D, 7)C, 8)D, 9)C, 10)A, 11)D, 12)C.

13. મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે ?
A)શક્તિ B)હિમ્મત C)સુરક્ષા D)ક્રાંતિ
14. ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રાન્ટ 2015 નું સ્થળ જણાવો.
A)અમદાવાદ B)ગાંધીનગર C)વડોદરા D)સુરત
15. પ્રધાનમંત્રીની"અંત્યોદય અન્ન યોજના"હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ.....કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે.
A)18 B)24 C)20 D)12
16. રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
A)બ્રહ્મોયોગી યોજના B)સંકલિત ધાન્ય વિકાસ યોજના
C)સેરી કલ્ચર યોજના D)માનવ ગરીમા યોજના
17. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી?
A)ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવા
B)ટ્રેક્ટરનો ખરીદીમાં સબસીડી આપવા
C)વણકરોનો હાથશાળોના આધુનિકીરણ માટે સબસીડી આપવા
D)શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા.
18. સંપૂર્ણ ગ્રમિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો....અને રાજ્ય સરકારનો ફાળો....રાખવામાં આવ્યો છે?
A)65% અને 35% B)70% અને 30%
C)75% અને 25% D)60% અને 40%
19. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?
A)સમૃદ્ધિ યોજના B)સુકન્યા સમૃદ્ધિ યોજના
C)કન્યા સમૃદ્ધિ યોજના D)બેટી સમૃદ્ધિ યોજનાકક
20. "મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો."આ વાક્ય કોનું છે ?
A)મા.શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા B)મા.શ્રીનરેન્દ્રભાઈ મોદી
C)મા.સુશ્રી આનંદીબેન પટેલ D)મા.સુશ્રી વસુબહેન ત્રિવેદી

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

21. કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉદ્યોગના કારીગરોને બેંકો મારફતે નાણાકીય લોન/સહાય આપવામાં આવે છે ?
A)શ્રમીક કલ્યાણ યોજના B)શ્રી વાજપાઈ બેંકેબલ યોજના
C)મુખ્યમંત્રી જન સહાય યોજના D)લઘુ ઉદ્યોગ સહાય યોજના!
22. ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ?
A)કૃષિ તાલીમ યોજના B)સરસ્વતી સાધના યોજના
C)ચિરંજીવી યોજના D)કિશોરી શક્તિ યોજના
23. રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ?
A)શિક્ષણ B)ગેસ સબસિડી
C)અનાજ સબસિડી D)પૂર રાહત
24. રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ?
A)ઈ-પ્રોક્યુમેન્ટ B) ઈ-ગ્રામ C)ઈ-ધરા
D)ઈ-સેવા
25. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?
A)નિર્મળ ગામ B)પવિત્ર ગામ
C)તીર્થ ગામ D)પાવન ગામ
26. ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ?
A)e-procurement B)e-Gram Vishwa gram
C)e- Dhara D)Swagat Online

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

27. કલ્પસર યોજના શાને આધારિત છે ?
A)સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના
B)મહિલા સશક્તિકરણ
C)વિન્ડ પ્રોજેક્ટ D)સોલાર પ્રોજેક્ટ

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

28. 'સ્વાગત_ઓનલાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?
A)માહિતીનું પ્રસારણ B)શિક્ષણ
C)આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
D)લોક ફરિયાદોનું નિવારણ
29. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?
A)વિદ્યાલક્ષ્મી બોન્ડ B)વિદ્યાદીપ
C)સરસ્વતી સાધના યોજના D)ચિરંજીવી યોજના
30. ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ.........
A)SCOPE B)IELTS C)GUJCET D)E-Bhasha
31. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત પીપીપી મોડેલનું આખુ નામ શું છે ?
A)Partnership of Public People
B)Private Public parternership
C)Public Private parternership
D)Personal Public parternership

13)B, 14)B, 15)B, 16)C, 17)D, 18)C, 19)B, 20)B, 21)B, 22)A, 23)B, 24)A, 25)C, 26)B, 27)A, 28)D, 29)B, 30)A, 31)C.

32. જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીંગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી..........
A) અટલબિહારી વાજપાઈ B) રાજીવ ગાંધી
C) નરેન્દ્ર મોદી D) નરસિંહ રાવ

33. કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ?
A) સૌથી વધુ સાક્ષરતા હોય
B) પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય
C) આર્થિક રીતે સ્વનિર્ભર હોય
D) સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય

GPSC પેપર - 1 - 2017

34. નીચેના પૈકી ક્યું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ?
A) શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ
B) કેપીટેશન ફી પર પ્રતિબંધ
C) રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ
D) ઉપરના પૈકી કોઈ નહીં

35. માર્ચ-2015માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતું શું છે ?
A) સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી.
B) બાળકીઓને તકનીકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો.
C) સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસોનું સંકલન કરવું.
D) ઉપરના તમામ

36. "પ્રધાનમંત્રી જન ધન યોજના"નું સૂત્ર શું છે ?
A) હમારા ખાતા હમારા સ્વાભિમાન
B) હમારા ખાતા ભાગ્ય વિધાતા
C) મેરા ખાતા ભાગ્ય વિધાતા D) સબ કા ખાતા સબ કા વિકાસ

GPSC પેપર - 2 - 2017

37. ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી ક્યો ઘટક નથી ?
A) મમતા મુલાકાત B) મમતા નોંધ
C) મમતા સંદર્ભ D) મમતા કલ્યાણ

38. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ?
A) ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા
B) ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ
C) LED બલ્બનું વિતરણ D) ઉપરના તમામ

39. GARV, UDAY અને TARANG ભારત સરકારના ક્યા મંત્રાલયની પહેલ છે ?
A) સુરક્ષા મંત્રાલય B) સૂચના પ્રાદ્યોગિકી મંત્રાલય
C) ઉર્જા મંત્રાલય D) કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય

40. નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ?
A) પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)
B) વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રાદ્યોગિકી મંત્રાલય
C) NITI આયોગ
D) વાણિજ્ય મંત્રાલય

41. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર "સંપદા" (SAMPADA) યોજના કઈ બાબત અંગેની છે ?
A) ખાણકામ B) ફૂડ પ્રોસેસિંગ C) ગૃહનિર્માણ D) શિક્ષણ

42. ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના .... % રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.
A) 30% B) 25% C) 20% D) 10%

GPSC MAINS પેપર - 1 - 2016

43. ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ?
A) પ્રધાનમંત્રી કૌશલ યોજના
B) પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના
C) પ્રધાનમંત્રી જન-ધન યોજના
D) ઉપરના પૈકી એકપણ નહી

44. JAM એટલે શું ?
A) જનતા-આરોગ્ય-માતા B) જનધન-આરોગ્ય-મોબાઈલ
C) જનધન-આધાર-મોબાઈલ D) જનધન-આધાર-માતા

45. MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ?
A) 365 દિવસ B) 300 દિવસ C) 100 દિવસ D) 200 દિવસ

46. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને ક્યા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ?
A) 2017 B) 2019 C) 2022 D) 2024

47. અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ?
A) 1970 B) 2000 C) 1995 D) 2002

48. 'ઓપરેશન ફલડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે?
A) પૂર શમન B) પૂર પુનઃવસન
C) શ્વેતક્રાંતિ લાવવી D) અનાજમાં સ્વનિર્ભરતા

32)C, 33)D, 34)D, 35)A, 36)C, 37)D, 38)A, 39)C, 40)C, 41)B, 42)D, 43)A, 44)C, 45)C, 46)B, 47)B, 48)C.

49. ઝુપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ ક્યા કાર્યક્રમ હેઠળ છે ?
A)શહેરી ઝુપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા
B)નહેરુ રોજગાર યોજના
C)જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન
D)શહેરી માળખા અને શાસન કાર્યક્રમ

GPSC MAINS પેપર - 2 - 2016

50. જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે.:
A)24 કલાક B)48 કલાક C) 05 દિવસ D) 10 દિવસ

51. ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે?
A)નેશનલ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક (Bharat Net)
B)ડાયલ. ગવ (Dial.gov)
C)ઈ-તાલ (e-Tall)
D)મેઘરાજ

52. ભારત સરકાર દ્વારા પ્રાયોજિત 'સૂર્યમિત્ર' કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ ક્યા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ?
A)સૂર્યમુખી તેલ ઉત્પાદન B) સોલર ટેક્નોલોજી
C) રણ ખેતી (Desert Farming) D) ઉપરના તમામ

53. નીચેના પૈકી કઈ માહિતી 'આધાર' માટે સાચી નથી ?
A)એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે
B)એ સ્વૈચ્છિક છે
C)એ ફક્ત પુખ્તવયના માટે છે
D)એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે.

54. દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રૌદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ?
A)નેશનલ નોલેજ નેટવર્ક
B)નેશનલ ઈન્ફોરમેટીક્સ નેટવર્ક
C)યુ.આઈ.ડી.એ.આઈ(UIDAI)
D)રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન

55. ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન-દસ્તાવેજો (Land Record)ની સહેલાઈથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવનું લક્ષ્યાંક રાખે છે ?
A)સ્વાગત (Swagat) B) ઈ ધરા (E-Dhara)
C) વિશ્વગ્રામ D) જીવસ્વાન (GSWAN)

56. 'નમામી ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?
A)ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ
B) ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો.
C) વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ
D)ઉપરના તમામ

57. 2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના.........ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી?
A)આયુર્વેદ અને યોગ માત્ર
B) યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર
C) સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર
D)ઉપરના બધા જ

58. રાષ્ટ્રીય ઉજાલા ડેશબોર્ડ (National Ujala Dashboard) નીચેનામાંથી શાની સાથે સંકળાયેલું છે ?
A)LED બલ્બનું વિતરણ
B) માંગના કુલ પ્રમાણમાં ઘટાડો કરવા
C) ગ્રાહકોના બિલ ઓછા કરવા
D)ઉપરના બધા જ

59. ભારત સરકારના નીચેના પૈકી ક્યા ખાતાએ 'રૂરલ આઈ.સી.ટી. પ્રોજેક્ટ' મૂક્યો છે ?
A)પોસ્ટ ખાતા B)રેલવે ખાતા
C)આરોગ્ય ખાતા D)ગ્રામીણ વિકાસ ખાતા

કોમર્શિયલ ટેક્સ ઇન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

60. માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ?
A)30 દિવસ B)35 દિવસ C)40 દિવસ D)45 દિવસ

61. માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ?
A)17 મુદ્દાઓ B) 16 મુદ્દાઓ C) 18 મુદ્દાઓ D) 15 મુદ્દાઓ

PSI GK - 4-3/5-3/2017

62. ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે કોને જાહેર કર્યા છે ?
A)હેમલત્તા મુખર્જી B)અર્પના જીતમલ
C)જ્યોત્સના કરપરીયા D)કુંવરબાઈ

49)C, 50)B, 51)A, 52)B, 53)C, 54)A, 55)B, 56)D, 57)D, 58)D, 59)A, 60)C, 61)A, 62)D.

63. હાલમાં ક્યા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ?
A) ગુજરાત B) મહારાષ્ટ્ર C) તેલંગાણા D) તમિલનાડુ

કોન્સ્ટેબલ - 2015

64. માહિતી અધિકારનો કાયદો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ?
A) 1947 B) 1993 C) 2003 D) 2005

બિન સચિવાલય ક્લાર્ક - 2016

65. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ "સૌની" યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો.
A) લાલપુર B) ધ્રોળ C) નખત્રાણા D) જોડીયા

66. રાષ્ટ્રીય પેન્શન યોજના(NPS)એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી.તેનું પુરુ નામ જણાવો.
A) પેન્સન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી
B) પેન્સન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી
C) પેન્સન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી
D) પેન્સન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી

67. ભારત સરકારના જાહેર સાહસો માટે 'મહારત્ન' યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ?
A) 2008-09 B) 2010-11 C) 2012-13 D) 2014-15

68. માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?
A) તા.3-10-2005 B) તા.15-6-2005
C) તા.12-10-2005 D) તા.31-12-2005

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

69. પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે?
A) કન્યા કેળવણી B) ગુણોત્સવ
C) શાળા પ્રવેશોત્સવ D) સ્કૂલ ગ્રેડિંગ

70. ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે?
A) રૂ. 1.00 લાખ B) રૂ. 2.00 લાખ
C) રૂ. 75 હજાર D) રૂ. 1.50 લાખ

71. માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો?
A) તા. 12-10-2005 B) તા. 14-11-2005
C) તા. 5-12-2005 D) તા. 10-12-2005

72. ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?
A) કમ્પ્યુટરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે
B) ડ્રિપ ઈરિગેશન પ્લાન્ટના નિર્માણ માટે
C) ગોદામ બનાવવા માટે
D) અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે

GPSC પ્રિલિમ - 2001

73. દેશના ક્યા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે?
A) મધ્યપ્રદેશ B) પશ્ચિમ બંગાળ
C) ગુજરાત D) પંજાબ

GPSC પ્રિલિમ - 2014

74. 'મિશન મંગલમ્' / 'સખી મંડળ'નો ઉદ્દેશ શું છે?
A) સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.
B) ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન
C) સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.
D) ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.

75. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફર્મેશન ટેક્નોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ?
A) Mygov B) સ્વચ્છ ભારત
C) બેટી વધાવો D) સલામત ભારત

76. બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ/સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે?
A) ચિરંજીવ યોજના B) મુખ્યમંત્રી અમૃતમ્ યોજના
C) આરસીએચ - 2 D) મમતા અભિયાન

77. ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ?
A) સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ
B) સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ
C) સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ
D) સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ

63)C, 64)D, 65)B, 66)C, 67)B, 68)B, 69)B, 70)A, 71)A, 72)C, 73)C, 74)D, 75)A, 76)B, 77)D.

78. ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી ક્યા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ?
A)એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ
B)અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય
C)શ્રવણ મંદ વ્યક્તિ D)દ્રષ્ટિહીન વ્યક્તિ

79. માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
A)ચિરંજીવી યોજના
B)રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
C)અમૃતમ્ યોજના D)બાલસખા યોજના

80. મહિલા અને બાળ વિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે.......
A)ઈન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ
B)ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ
C)ઈન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ
D)ઈન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ

81. ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના ક્યા નામથી ઓળખાય છે ?
A)શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
B)શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
C)શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
D)એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના

PSI ખાતાકીય - 23/04/2017

82. નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?
A)રાજીવ ગાંધી B)ગાંધીજી
C)જવાહરલાલ નેહરુ D)વિનોબા ભાવે

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

83. 'સૌની' યોજનાનું પૂરૂ નામ શું છે?
A)સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના
B)સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના
C)સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના
D)સૌરાષ્ટ્ર નહેર અપલિફ્ટ ઈરિગેશન યોજના

GPSC Class-1 - 2016

84. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ?
A)રસીકરણ કાર્યક્રમ B)પ્રાથમિક શિક્ષણ
C)નાના ઉદ્યોગોને મૂડી સહાય D)સોલાર પ્રોજેક્ટ

85. "મિશન મંગલમ્" યોજનાનો મુખ્ય હેતું શું છે ?
A)ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા
B)મોટા ઉદ્યોગોને મૂડીસહાય
C)પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય
D)ગ્રામીણ આવાસ

86. ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ?
A)રૂા. 10 B)રૂા. 20 C)રૂા. 30 D)રૂા. 50

87. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દિનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?
A)દવાઓ B)ખાતર
C)બિયારણ D)વિદ્યાર્થીઓ માટેની અભ્યાસસામગ્રી

88. સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.
A)અમદાવાદ B)ગાંધીનગર C)સુરેન્દ્રનગર D)ડાંગ

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

89. નીતિ આયોગ દ્વારા 'AIM' શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે?
A)અટલ ઈન્નોવેશન મીશન (Atal Innovation Mission)
B)એપ્લીકેશન ઇનોવેશન મીશન
C)અજય ઈવેન્ટ મીશન
D)અમર ઈકોનોમિક મીશન

90. હાલમાં જાહેર કરવામાં આવેલ "પ્રોજેક્ટ-શાઈન" ક્યા હેતુ માટે છે?
A)આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા
B)ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી
C)ખાનગી શાળાના સમકક્ષ બોર્ડીંગ શાળાઓનું સંચાલન કરવું.
D)શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા

91. 2017 માં જે "વાયબ્રન્ટ સમીટ" યોજાયેલ હતી તે કેટલામી સમીટ હતી.
A)5 B)6 C)7 D)8

GPSC Class - 2 - 29/1/2017

92. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે.
A)તા.15-12-2016 B)તા.16-12-2016
C)તા.10-12-2016 D)તા.17-12-2016

78)B, 79)A, 80)B, 81)C, 82)B, 83)A, 84)A, 85)A, 86)B, 87)A, 88)D, 89)A, 90)A, 91)D, 92)D.

93. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે?
A) રૂ.પાંચ લાખ B) રૂ.દસ લાખ
C) રૂ.ત્રણ લાખ D) રૂ.પંદર લાખ

94. ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે?
A) મહારાષ્ટ્ર B) રાજસ્થાન C) ઓરિસ્સા D) ગુજરાત

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

95. માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે?
A) ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ
B) આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
C) આદિવાસી મહિલાઓ માટેની યોજના
D) ઉપરના પૈકી એક પણ નહી

GPSC Class - 2 - 18/12/2016

96. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યકિતઓને લાભ મળે છે?
A) 18-50 B) 18-60 C) 18-70 D) 18-40

97. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય?
A) 10 લાખથી વધુ વસ્તીવાળા
B) 10-15 લાખથી વધુ વસ્તીવાળા
C) 50 લાખથી વધુ વસ્તીવાળા D) 1 કરોડથી વધુ વસ્તીવાળા

98. ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો.
A) ઉડે દેશ કા નાગરિક B) ઉડે દેશ કા ગરીબ નાગરિક
C) ઉડે દેશ કા આમ નાગરિક D) ઉપરોકત પૈકી એકપણ નહી

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

99. ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામા આવ્યો છે?
A) 14444 B) 101444 C) 145114 D) 121554

100. મહિલા પોલીસ વોલન્ટીયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું છે?
A) ઉત્તરપ્રદેશ B) આસામ C) હરિયાણા D) કેરળ

101. AEPS એટલે?
A) All Electronic Payments
B) Aadhar Enabled Payments System
C) All Employees Payments System
D) Aadhar Enabled Payment Site

GPSC Class - 2 - 12/2/2017

102. સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે?
A) SAGY B) SAHAJ
C) PAHAL Scheme D) PMKSY

103. "ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે?
A) બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા
B) તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.
C) વેચાણ વ્યવસ્થા સુધારવી
D) ઉપરોકત બધા જ હેતુઓ

104. દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામ ને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે?
A) RTI Act 2005 B) RTE Act 2005
C) RTE Act 2009 D) RTI Act 2009

105. "Performance on health outcome - A refernce guidebook" કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે?
A) નીતિ આયોગ B) આરોગ્ય આયોગ
C) ગુજરાત સરકાર D) વર્લ્ડ હેલ્થ ઓરગનાઈઝેશન

106. સ્માર્ટ સિટી નાં કયા મુખ્ય લક્ષણો છે?
A) જમીનનો મહત્તમ ઉપયોગ
B) દરેક માટે ઘરનું આયોજન
C) ગીચતા, પ્રદુષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતિમાં વધારો
D) ઉપરોકત બધીજ બાબતો

GPSC Class - 2 - 28/1/2017

107. પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે?
A) અન્નપૂર્ણા B) મધ્યાહન ભોજન યોજના
C) અંત્યોદય યોજના D) ઉપરોકત બધી જ યોજનાઓ

108. "સ્વચ્છ ભારત મીશન" દ્વારા કયા રાજયને 'Open defecation Free state' જાહેર કરેલ નથી?
1) કેરાલા
2) ગુજરાત
3) આંધ્રપ્રદેશ
A) 1 B) 2 અને 3 C) 1, 2 અને 3 D) 1 અને 3

93)B, 94)D, 95)B, 96)C, 97)D, 98)C, 99)A, 100)C, 101)B, 102)A, 103)D, 104)C, 105)A, 106)D, 107)D, 108)B.

GPSC Class-1 - 15/01/2017

109. ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા "ગ્રામ મિત્ર"ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે?
A) રૂ.1000, 5 B) રૂ.2000, 3
C) રૂ.3000, 4 D) રૂ.1500, 2

110. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનૂકુળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે?
A) ઈ.સ.2020 B) ઈ.સ.2021 C) ઈ.સ.2022 D) ઈ.સ.2019

GPSC Class-1 - 15/01/2017

111. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેંકેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર/ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?
A) પાંચ લાખ B) ત્રણ લાખ C) બે લાખ D) એક લાખ

112. રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ. .... દંડ કરી શકે.
A) ₹ 250/- B) ₹ 500/- C) ₹ 2500/- D) ₹ 5000/-

113. રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ યોજનાનું સંચાલન કઈ નોડેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે ?
A) યુ.જી.સી. B) ભારત સરકાર
C) રાજ્ય સરકાર D) જિલ્લા પંચાયત

114. કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ?
A) 1954 B) 1952 C) 1957 D) 1956

115. ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે .... મહિલા હેલ્પલાઈન શરૂ કરી છે.
A) 181 B) 100 C) 1098 D) 101

116. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?
A) વીમા જીવન B) શિક્ષણ દીપ
C) જ્યોતિ દીપ D) વિદ્યાદીપ

117. ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ?
A) આંગણવાડીના કર્મચારીઓ B) આશા વર્કરો
C) મેલ/ફીમેલ હેલ્થ વર્કરો D) ઉપરોક્ત બધા જ

118. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ?
A) 25,000/- B) 15,000/- C) 10,000/- D) 50,000/-

119. ગુજરાત અને દેશના ગામડાઓના સામાજિક વિકાસ માટેની કઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?
A) સામૂહિક સેવા યોજનાઓ B) ગ્રામ્ય સેવા યોજનાઓ
C) રાજ્ય સેવા યોજનાઓ D) રાષ્ટ્રીય સેવા યોજનાઓ

120. આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ?
A) ₹ 26,000/- સુધી B) ₹ 75,000/- સુધી
C) ₹ 20,000/- સુધી D) ₹ 25,000/- સુધી

121. RTEના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવેલ છે ?
A) 1:30 B) 1:20 C) 1:50 D) 1:45

122. અનુસૂચિત જાતિ / જન જાતિ માટે માનવ ગરિમા યોજના શું છે?
A) સ્વરોજગારી માટે કિટ્સ B) શિક્ષણ માટે સ્કોલરશીપ
C) શિક્ષણ માટે લોન D) સાયકલ માટે સહાય

123. ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ?
A) 18 B) 22 C) 36 D) 40

124. માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ?
A) ઈ.સ.2004 B) ઈ.સ.2002 C) ઈ.સ.1947 D) ઈ.સ.1951

125. ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ ક્યા ક્ષેત્રને સંબંધિત છે?
A) શિક્ષણ B) કૃષિ C) વિજ્ઞાન D) પર્યાવરણ

126. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબોધી અરજી લખવાની હોય છે ?
A) રાષ્ટ્રપતિ B) મુખ્યમંત્રી
C) કલેક્ટર D) જાહેર માહિતી અધિકારી

127. વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ?
A) 2008-09 B) 2005-06 C) 2002-03 D) 2000-01

128. નીચેનામાંથી ક્યું જોડકું સાચું નથી ?
1. સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત
2. ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ
3. પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા
4. ઈ-ગ્રામ - કમ્પ્યૂટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા
A) 2 B) 3 C) 1 D) 4

109)A, 110)C, 111)D, 112)A, 113)A, 114)B, 115)A, 116)D, 117)D, 118)A, 119)D, 120)D, 121)A, 122)A, 123)A, 124)B, 125)A, 126)D, 127)A, 128)A.

129. માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ .... ₹ ચૂકવવાના હોય છે.

A) ₹ 2/- B) ₹ 20/- C) ₹ 50/- D) ₹ 100/-

130. કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

A) કસ્તુરબા પોષણ સહાય યોજના

B) અન્નપ્રાશન દિવસ યોજના

C) દૂધ સંજીવની યોજના

D) અન્નમ્ બ્રહ્મ યોજના

131. નીચેનામાંથી ક્યો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ?

A) રાષ્ટ્રીય મહિલા કોષ B) મહિલા સમૃદ્ધિ યોજના

C) ઈન્દિરા મહિલા યોજના D) જવાહર રોજગાર યોજના

132. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કઈ હોસ્ટેલની યોજના શરૂ કરી છે ?

A) એકલવ્ય હોસ્ટેલ B) સમરસ હોસ્ટેલ

C) કુમાર-કન્યા છાત્રાલય D) ઉપરની એક પણ નહીં

133. ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ?

A) ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી

B) અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી

C) અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી

D) ઉપર્યુક્ત તમામ

134. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ?

A) ₹ 20/- B) ₹ 50/- C) ₹ 100/- D) ₹ 10/-

135. .... એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે.

A) બાળ સંરક્ષણ ગૃહ B) નારી સંરક્ષણ ગૃહ

C) સ્પેશ્યલ હોમ D) ફોસ્ટર હોમ

136. ભારતના ક્યા રાજ્યમાં સૌપ્રથમ RTIનો અમલ કર્યો ?

A) તમીલનાડુ B) મહારાષ્ટ્ર C) ગુજરાત D) પંજાબ

137. નવી સ્વર્ણીમ યોજના કોના માટે છે ?

A) શિક્ષિત યુવાનો

B) ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે

C) ખેડૂતો માટે

D) વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે

138. ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ?

A) ₹ 5,000/- B) ₹ 7,000/- C) ₹ 10,000/- D) ₹ 15,000/-

139. સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

A) ખેડૂતોને પ્રોત્સાહિત કરવા.

B) સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું

C) સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી.

D) મહિલા સ્વાવલંબન

140. ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ?

A) 75 : 25 મુજબ B) 60 : 40 મુજબ

C) 90 : 10 મુજબ D) 100% કેન્દ્ર પ્રાયોજિત

141. આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ?

A) 6 વર્ષથી નીચેના બાળકો B) સગર્ભા અને ધાત્રી મહિલા

C) 15-44 વર્ષની વયજૂથની મહિલા D) ઉપરના તમામ

142. મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ?

A) 2012-13 B) 2010-11 C) 2013-14 D) 2000-2001

143. ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે..........

A) સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.

B) આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે.

C) ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતિને કારણે.

D) ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે.

144. માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ?

A) પ્રોટોકોલ ડિસ્કલોઝર B) પ્રાઈવેટ ડિસ્કલોઝર

C) પ્રોટોકોલ ડિસ્કલોઝર D) પ્રાઈમ ડિસ્કલોઝર

145. માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે ?

A) રોકડેથી B) ડિમાન્ડ ડ્રાફ્ટથી

C) પોસ્ટલ ઓર્ડરથી D) ઉપર્યુક્ત તમામ

146. માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ?

A) ₹ 10 B) ₹ 20

C) ₹ 20 D) કોઈ ફી ચૂકવવાની હોતી નથી

147. સબળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે?

A) 18 - 25 B) 45 - 60 C) 3 - 10 D) 11 - 18

148. વિચરતિ વિમુક્ત જાતિના મેધાવી વિદ્યાર્થીઓ માટે કઈ યોજના અમલમાં છે ?

A) પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ

B) ટેલેન્ટ પૂલ યોજના

C) ટુલકિટ

D) કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ

129)C, 130)C, 131)B, 132)B, 133)D, 134)A, 135)A, 136)A, 137)B, 138)B, 139)C, 140)D, 141)D, 142)A, 143)D, 144)C, 145)D, 146)D, 147)D, 148)B.

149. સંકલિત બાળ સંરક્ષણ યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
A)2009 - 2010 B) 2012 - 2013
C) 2005 - 2006 D) 2008 - 2009

150. પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ?
A)અરજી પત્ર દ્વારા B) E-mail application દ્વારા
C) રૂબરૂ D)ઉપર્યુક્ત તમામ

151. બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ?
A) મમતા અભિયાન B) ચિરંજીવ યોજના
C) મુખ્યમંત્રી અમૃતમ યોજના D) આર.સી.એસ.-2

152. દુનિયાના ક્યા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ?
A)યુ.એસ.એ. B)યુ.કે. C) સ્વિડન D) ફ્રાન્સ

153. માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ ક્યા વર્ષમાં થયો ?
A) 2009 B) 2006 C) 2002 D) 2005

154. સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
A) SC B) ST C) BPL D) APL

155. આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ?
A) 108 ઈમરજન્સી સેવા B) ખિલખિલાટ
C) આરોગ્ય સંજીવની D) ઉપરોક્ત બધીજ

156. ફૂલમણિ દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે?
A) બાળ લગ્ન B) સતીપતી પ્રથા
C) વિધવા લગ્ન D) વિધવા વિવાહ પ્રતિબંધ

157. બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?
A) જનરલ કેટેગરી B) અનુસૂચિત જનજાતિ
C) અનુસૂચિત જાતિ D) પછાત વર્ગ

158. વિદ્યાલક્ષ્મી બોન્ડનો મુખ્ય હેતુ શું છે ?
A) વધારે બાળાઓ શિક્ષા લેતી થાય.
B) લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે.
C) બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે.
D) ઉપરોક્ત બધી જ બાબતો.

159. 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ?
A) અનુસૂચિત જાતિ માટે
B) અનુસૂચિત જનજાતિ માટે
C) સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે
D) વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે

160. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ?
A) ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ
B) ગ્રામ પંચાયત
C) તાલુકા પંચાયત D) જિલ્લા પંચાયત

161. વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?
A) તીર્થગ્રામ યોજના B) પંચવટી યોજના
C) કુંવરબાઈનું મામેરું યોજના D) જ્યોતિગ્રામ યોજના

162. નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે?
A) ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
B) ગુજરાત રાજ્યના તિર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે.
C) ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે.
D) ગુજરાતની નદીઓ પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે.

163. દીકરી યોજનાનો ઉદ્દેશ ક્યો છે ?
A) દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો
B) કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો
C) દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો
D) દીકરીઓને કન્યાદાન આપવાનો

GPSC Class-1 - 15/01/2017

164. નેશનલ ફુડ સિક્યોરીટી એક્ટ - 2013 અન્ય ક્યા નામે ઓળખાય છે?
A) નેશનલ ફુડ એક્ટ B) ફુડ એક્ટ
C) રાઈટ ટુ ફુડ એક્ટ D) ન્યુટ્રીશન સિક્યોરીટી એક્ટ

165. સબલા સ્કીમના લાભાર્થી કોણ છે?
A) એડોલસન્ટ ગર્લ્સ B) એડોલસન્ટ બોયઝ
C) સગર્ભા માતાઓ D) 15 થી 49 વર્ષની બહેનો

166. નવજાત શિશુને ફક્ત માતાનું ધાવણ-પાણી પણ નહી ક્યાં સુધી આપવું જોઈએ?
A) 4-6 મહિના B) 6 મહિના C) 2 વર્ષ D) 1 વર્ષ

167. IGNSY યોજનાના લાભાર્થી કોણ છે?
A) ધાત્રી માતા B) કિશોરીઓ
C) સગર્ભા માતા D) ઉપરોક્તમાંથી કોઈ નહી

168. નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી?
A) શાળાએ જતા બાળકો B) સગર્ભા માતા
C) 3 થી 6 વર્ષના બાળકો D) કિશોરીઓ

149)A, 150)D, 151)C, 152)C, 153)A, 154)C, 155)D, 156)A, 157)C, 158)D, 159)B, 160)D, 161)B, 162)A, 163)B, 164)C, 165)A, 166)B, 167)C, 168)A.

169. સમુદાયમાં પાંડુરોગ (એનીમીયા) ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે?
A)બ્લડ સુગર B) હિમોગ્લોબીન
C)સીરમ ફેરીટીન D) કોલસ્ટરોલ

170. આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે?
A)વજન પ્રમાણે ઉંચાઈ B) ઉંમર પ્રમાણે ઊંચાઈ
C)ઉંમર પ્રમાણે વજન D) ઊંચાઈ પ્રમાણે વજન

171. તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે?
A)મેડીકલ ઓફીસર
B)આઈ.સી.ડી.એસ. યોજનાના સી.ડી.પી.ઓ.
C)સુપરવાઈઝર D)એ.એન.એમ.

172. આંગણવાડીમાં પુરકપોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે?
A)0 થી 6 મહિનાના બાળકો B) 6 થી 12 મહિનાના બાળકો
C) 1 થી 3 વર્ષના બાળકો D) 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો

173. શિશુ એટલે......
A)6 થી 12 મહિનાનું બાળક B) 0 થી 6 મહિનાનું બાળક
C)0 થી 1 વર્ષનું બાળક D)ઉપરોક્તમાંથી કોઈ પણ નહી

174. ....વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે?
A)4 થી 6 વર્ષ B) 1 થી 6 વર્ષ C) 3 થી 6 વર્ષ D) 5 થી 6 વર્ષ

175. PEM નું પૂરું નામ.........
A)પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ
B)પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન
C)પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન
D)આમાંથી કોઈ પણ નહી

176. PEM વાળા બાળકો........
A)દુબળા, નિરસ અને ચીડીયા દેખાય છે.
B)તંદુરસ્ત દેખાય છે.
C)ચપળ અને સ્ફુર્તિયુક્ત દેખાય છે.
D)વધુ લાલાશ ધરાવતા દેખાય છે.

177. ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ....વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો.
A) 1975-76 B) 1976-77 C) 1978-79 D) 1970

178. મધ્યાહ્ન ભોજન યોજના ....તરીકે ઓળખાય છે.
A)સ્કુલ લંચ પ્રોગ્રામ B) સ્કુલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
C)સ્કુલ એજ્યુકેશન પ્રોગ્રામ D)સ્કુલ યુનીટી પ્રોગ્રામ

179. મધ્યાહ્ન ભોજન યોજના (MDM) ના લાભાર્થીઓ.........છે.
A)સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો
B) 6 થી 14 વર્ષના બાળકો
C) 6 થી 11 વર્ષના બાળકો
D)ઉપરોક્તમાંથી એક પણ નહી

180. NHM એટલે.........
A)નેશનલ હેલ્થ મિશન B) ન્યુટ્રીશન હેલ્થ મિશન
C)નેશનલ હેલ્થ મિડીયા D)નેશનલ હાઉસ મિશન

181. આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે?
A)મહિલા અને બાળવિકાસ વિભાગ B) આરોગ્ય વિભાગ
C) શિક્ષણ વિભાગ D)ગ્રામ વિકાસ વિભાગ

182. PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ?
A)પ્રોટીન અને કાર્બોદિત B) પ્રોટીન અને ચરબી
C) પ્રોટીન D)ઉપરોક્તમાંથી કોઈ નહી

183. ECCE નું પૂરું નામ.........
A)અરલી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન
B)અરલી કમ્યુનિકેશન કેર એન્ડ એજ્યુકેશન
C)અરલી ચાઈલ્ડ સેન્ટર એજ્યુકેશન
D)અરલી ચાઈલ્ડ કમ્યુનિકેશન એજ્યુકેશન

184. આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ.......છે.
A)6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ
B) 6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો
C) 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ
D)ઉપરોક્ત બધા જ

185. Accredited Social Health Activist (ASHA) એટલે......
A)ગ્રામ્ય કક્ષાની સ્ત્રી આરોગ્ય કાર્યકર
B)ગ્રામ્ય લોકો તથા આરોગ્ય સેવાઓને જોડતી કડી
C)સ્થાનિક સ્ત્રીઓમાંથી સ્થાનિક લોકો દ્વારા પસંદગી પામતી સ્વૈચ્છિક કાર્યકર
D) ઉપરોક્ત બધા જ

186. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કોણ ફરજ બજાવે છે?
1) લેબોરેટરી ટેકનિશ્યન 2) સેનેટરી ઓફીસર
3) મેડિકલ ઓફિસર 4) હેલ્થ વર્કર
A) 1, 3, 4 B) 2, 3, 4 C) 1, 2, 3 D) 1, 2, 4

187. સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે કયા આવેલું હોય છે?
A)તાલુકા કક્ષાએ B) ગ્રામ્ય કક્ષાએ
C) શહેરી વિસ્તારમાં D)ઉપરોક્તમાં કોઈ નહી

188. ગુજરાત રાજય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે?
A)ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ
B)ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રીસર્ચ
C)ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર
D)રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ

189. સ્ત્રીઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો ....છે
A)કસરતનો અભાવ B) કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ
C) રજોનિવૃત્તિ (મેનોપોઝ) D)ઉપરોક્ત બધા જ

169)B, 170)C, 171)B, 172)D, 173)C, 174)C, 175)B, 176)A, 177)A, 178)A, 179)A, 180)A, 181)A, 182)A, 183)A, 184)D, 185)D, 186)A, 187)A, 188)A, 189)D.

190. હરતા ફરતા ઘોડીયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી?
A) શ્રીમતી મીરા મોહન B) શ્રીમતી મીરા પાઠક
C) શ્રીમતી મીરા નાયક D) શ્રીમતી મીરા મહાદેવન

191. સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે?
A) ચિરંજીવી યોજના B) કિશોરી શકિત યોજના
C) મિશન મંગલમ D) ઉપરોક્તમાંથી કોઈ નહી

192. સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ /વિરોધી રસી અપાય છે?
A) હિપેટાઈટીસ B) ટીટનેસ
C) યેલો ફીવર D) મેનીનજાઈટીસ

193. આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતો MPR એટલે.....
A) મન્થલી પ્રોગ્રેસ રીપોર્ટ ઓફ આંગણવાડી
B) મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર રીસોર્સીઝ
C) મેન્ટલ પ્રોગ્રેશન રીપોર્ટ
D) માઈનર પ્રોગ્રેસ રીપોર્ટ

194. નેશનલ ફુડ સીક્યોરીટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે?
A) દરરોજ મફત દવાનો લાભ B) દરરોજ મફત દૂધનો લાભ
C) દરરોજ મફત નાસ્તાનો લાભ D) દરરોજ મફત અનાજનો લાભ

195. NFHS ડેટા એટલે......
A) નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ડેટા
B) નેશનલ ફાઈલેરીયા હેલ્થ સ્ટેટિસ્ટીક
C) નેશનલ ફાઉન્ડેશન ફોર હેલ્થ સર્વીસીઝ
D) ન્યુ ફેમીલી હાઉસીંગ સ્કીમ

196. મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે?
A) સગર્ભા માતા અને નવજાત શિશુ
B) ધાત્રી માતા
C) ફક્ત નવજાત શિશુ
D) સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ

197. સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે ....
A) વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ
B) કુદરતી આવતી આફત સમયે કરવામાં આવતી સહાય
C) રીટેલ શોપ
D) આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

198. ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ?
A) મહિલા બોન્ડ B) સરસ્વતી બોન્ડ
C) વિધ્યાલક્ષ્મી બોન્ડ D) ગુર્જરલક્ષ્મી બોન્ડ

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

199. જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ?
A) 30 દિવસ B) 45 દિવસ C) 15 દિવસ D) 60 દિવસ

200. મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ?
A) દેશની સેનાના આધુનિકરણ માટેનો
B) માતા, કિશોરીઓને આર્યન-ફોલિક એસીડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરો પાડવાનો.
C) દેશની સાંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો
D) ઉપર પૈકી એકપણ નહીં

201. મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ?
A) ભૂચરચોરી B) ભૂજોડી C) પાલનપુર D) આહવા

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

202. કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે?
A) આયુર્વેદિક સારવાર B) ઉડ્ડયન તાલીમ
C) જળચર સંશોધન D) ટકાઉ કૃષિવિકાસ

203. ભારતનો પ્રથમ મહત્વાકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેક્ટ કઈ રાજ્યસરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે?
A) હરિયાણા B) આંધ્રપ્રદેશ C) પંજાબ D) ઉત્તર પ્રદેશ

204. "સૌની" યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે?
A) 1 B) 2 C) 3 D) 4

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

205. નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના આંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે?
A) AMRUT B) JNNURM C) UIDSSMT D) NUIS

206. "PURA' યોજના/વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યુ હતું?
A) એ.વી.બાજપાઈ B) એ.પી.જે અબ્દુલકલામ
C) મનમોહનસિંહ D) પ્રણવ મુખર્જી

207. ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે?
A) દ્વારકા B) અંબાજી C) પાલીતાણા D) સોમનાથ

208. નીચેના પૈકી કયા રોગનો "ઈન્દ્રધનુષ" મિશન હેઠળ સમાવેશ થતો નથી?
A) ખાંસી B) પોલીયો C) સ્વાઈન ફ્લુ D) ક્ષય

190)D, 191)A, 192)B, 193)A, 194)D, 195)A, 196)D, 197)A, 198)C, 199)A, 200)B, 201)B, 202)D, 203)C, 204)D, 205)C, 206)B, 207)A, 208)C.

209. "પ્રોજેક્ટ સનરાઈઝ"નો મુખ્ય ઉદ્દેશ શું છે?
A) આઠ ઉત્તર- પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ
B) ઝૂંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ
C) ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ
D) ઉપરના પૈકી કોઈ નહીં

210. સરકારે શરૂ કરેલ ટોલફ્રી નંબર 1924..........માટે છે.
A) પોસ્ટ લગતી ફરિયાદ B) ખેતી લગત ફરિયાદ
C) સ્વાસ્થય લગત ફરિયાદ D) સ્વચ્છતા લગત ફરિયાદ

GPSC Class - 2 - 18/03/2017

211. જાન્યુઆરી 2017માં "વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2017" યોજવામાં આવેલી હતી, તે કેટલા સમીટ હતી?
A) 6 B) 7 C) 8 D) 9

212. મનરેગા બાબતે કયું વાકય / વાકયો સાચા છે?
1) નોંધાયેલ વ્યકિતને ગ્રામપંચાયત, જોબકાર્ડ આપે છે.
2) યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજય સરકાર વહેંચી લે છે.
3) બાંધકામ અંગેની જવાબદારી ખાનગી ઠેકેદારોને આપવામાં આવે છે.
A) 1 અને 2 B) 1 અને 3 C) 2 અને 3 D) 1, 2 અને 3

213. "NABH" નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે?
A) દવાખાનું અને હોસ્પિટલ B) હોટલ અને લોજ
C) સાયન્સ કોલેજ D) વાહન વ્યવહાર માટેના રસ્તાઓ

GPSC Class - 1 - 28/01/2017

214. સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?
A) રોજગાર વિનિયમ કચેરી B) મામલતદાર કચેરી
C) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી D) કલેકટર કચેરી

215. ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે?
A) 4 B) 2 C) 3 D) 5

નાયબ ચિટનીશ - 02/06/2015

216. બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?
A) ઈન્દીરા આવાસ યોજના B) સરદાર આવાસ યોજના
C) રાજીવ ગાંધી આવાસ યોજના D) મહાત્મા ગાંધી આવાસ યોજના

217. તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?
A) તીર્થધામોનું જતન
B) ધોરણ-7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
C) સામુહિક એખલાસ D) ભાઈચારાની ભાવના

218. રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?
A) 2 ઓકટોબર, 2001 B) 11 સપ્ટેમ્બર, 2004
C) 26 જાન્યુઆરી, 2005 D) 15 ઓગષ્ટ, 2006

219. રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?
A) 26 જાન્યુઆરી, 2001 B) 1 મે, 1998
C) 24 જાન્યુઆરી, 1999 D) 15 ઓગષ્ટ, 1998

220. આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે?
A) 20 B) 15 C) 30 D) 25

નાયબ ચિટનીશ - 05/02/2017

221. ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત 'VCE' નું આખું નામ શું છે ?
A) Village Computer Entrepreneur
B) Village Computer Expert
C) Village Computer Export
D) Village Chemical Entrepreneur

222. રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજ સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ?
A) Integrated Work Development Management System
B) Internal Work Development Management System
C) Integrated Working Design and Management System
D) Integrated Workflow and Document Management System

223. રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડોક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થયની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?
A) બાલ ઉછેર યોજના B) સ્વસ્થ શિશુ વિહાર
C) સ્વસ્થ બાલ યોજના D) બાલસખા યોજના

224. ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ?
A) TCS B) ઈન્ટેલ C) ઈન્ફોસીસ D) NIC ગાંધીનગર

GPSC Class - 2 - 16/04/2017

225. નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે?
A) 2011 B) 2012 C) 2013 D) 2014

209)A, 210)A, 211)C, 212)A, 213)A, 214)C, 215)B, 216)B, 217)A, 218)B, 219)C, 220)D, 221)A, 222)D, 223)D, 224)D, 225)C.

226. પ્રોજેક્ટ સક્ષમ (Project Saksham) શાની સાથે સંકળાયેલ છે?
A) બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય
B) દેશની સુરક્ષા
C) CBSE નાં IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
D) દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા

GPSC Class - 2 - 02/04/2017

227. ગુજરાતનું ક્યું શહેર ત્રીજા સ્માર્ટ સીટી તરીકે પસંદગી પામ્યું છે?
A) ગાંધીનગર B) વડોદરા C) સુરત D) રાજકોટ

228. ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ? -
A) રેશન કાર્ડ B) આવકના દાખલા
C) મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ D) ઉપરની તમામ

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

229. "પ્રગતિ" (PRAGATI) (Pro-Active Governance and Timely Implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે ક્યો દિવસ નિયત કરવામાં આવેલ છે ?
A) દરેક મહીનાનાં પ્રથમ બુધવાર B) દરેક મહિનાનો ચોથો બુધવાર
C) દરેક મહીનાનો ચોથો શુક્રવાર D) દરેક મહીનાનો પ્રથમ શુક્રવાર

230. નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ?
A) ઈન્દિરા આવાસ યોજના B) સરદાર પટેલ આવાસ યોજના
C) મુખ્યમંત્રી આવાસ યોજના D) શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના

GPSC Class - 2 - 12/02/2017

231. સુકન્યા સુમૃધ્ધિ યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી?
A) જાન્યુઆરી - 15 B) ફેબ્રુઆરી - 15
C) જાન્યુઆરી - 14 D) જાન્યુઆરી -16

232. સરકારી આરોગ્ય ક્ષેત્રમાં 'ઈ-હેલ્થ પ્રોજેકટ' શરૂ કરનાર કયું રાજય પહેલું છે?
A) આંધ્રપ્રદેશ B) કેરાલા C) તમિલનાડુ D) ગુજરાત

GPSC Class - 1 - 09/04/2017

233. "ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)" અંતર્ગત સંસદ સભ્યને પ્રતિવર્ષ કેટલી રકમની ફાળવણી કરવામાં આવે છે ?
A) 1 કરોડ B) 2 કરોડ C) 5 કરોડ D) 4 કરોડ

234. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે ત્રણ યોજનાઓ શરૂ કરેલ છે. તેના નામ નીચે મુજબ રાખેલ છે.
A) શિશુ, કિશોર અને તરૂણ B) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ
C) કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી
D) ઉપર પૈકી એકપણ નહીં

235. કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકોમાં ફુટબોલની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી ક્યા મિશનની શરૂઆત કરવામાં આવેલ છે ?
A) મિશન X B) મિશન IX C) મિશન XI D) મિશન XII

GPSC Class - 2 - 04/03/2017

236. "પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ?
A) મેરા ખાતા ભાગ્ય વિધાતા B) મેરા ખાતા દેશ પહેચાન
C) એક ખાતા સબકે લીયે D) મેરા ખાતા અન્ન દાતા

237. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલ રકમ ક્યારે બમણી થાય છે?
A) 7 વર્ષ 3 માસ B) 6 વર્ષ 5 માસ
C) 8 વર્ષ 4 માસ D) 7 વર્ષ 6 માસ

238. પ્રથમ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્કિલ્સ ક્યા શહેરમાં બનશે?
A) ગાંધીનગર B) રાજગીર-નાલંદા
C) કાનપુર D) લખનૌ

239. અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ/લોગો.........નો છે.
A) આધાર B) પાસપોર્ટ
C) ડ્રાઈવિંગ લાઈસન્સ D) એકપણ નહીં

GPSC Class - 2 - 18/03/2017

240. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ?
A) ઈ.સ. 1987-88 B) ઈ.સ. 1993-94
C) ઈ.સ. 1991-92 D) ઈ.સ. 1996-97

241. માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ, 2005 હેઠળ માહિતી માંગનાર કઈ ભાષામાં લેખિતમાં અથવા ઈલેકટ્રોનિક માધ્યમ મારફતે જરૂરી ફી સાથે અરજી કરવી જોઈએ ?
A) અંગ્રેજી B) હિન્દી
C) જે તે વિસ્તારની રાજભાષા
D) અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજયભાષા

226)C, 227)B, 228)D, 229)B, 230)D, 231)A, 232)B, 233)C, 234)A, 235)C, 236)A, 237)C, 238)C, 239)A, 240)D, 241)D.

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

242. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના, કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે કરવામાં આવી હતી ?
A)2001 B)2005 C)2009 D)2007

243. માનવ ગરીમા યોજનામાં સાધન સહાય/રોકડ સહાય મહત્તમ મર્યાદા ક્યા સુધીની છે ?
A)રૂ.10,000 B)રૂ.20,000 C)રૂ.3,000 D)રૂ.6,000

244. ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે?
A)સંદેશા વ્યવહાર મંત્રી
B)માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી
C)વડાપ્રધાન
D)સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગ

245. ન્યુ આકાંક્ષા યોજના શું છે ?
A)પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યાવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના
B)પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના
C)સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના
D)પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના

246. નીચેનામાંથી ક્યો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ?
A)રાષ્ટ્રીય મહિલા કોષ B)મહિલા સમૃદ્ધિ યોજના
C)ઈન્દિરા આવાસ યોજના D)જવાહર રોજગાર યોજના

247. સબલા યોજના ક્યા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ?
A)18-25 વર્ષ B)45-60 વર્ષ C)3-10 વર્ષ D)11-18 વર્ષ

248. આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ?
A)સાંસદોને
B)રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને
C)સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
D)રાજકીય પક્ષોને

249. રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ?
A)50 : 50 B)90 : 10 C)75 : 25 D)60 : 40

250. સ્વ.સહાય જૂથને અનુરૂપ કાર્યક્રમ ક્યો છે ?
A)સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના
B)બાલિકા સમૃદ્ધિ યોજના
C)જવાહર રોજગાર યોજના
D)નહેરુ રોજગાર યોજના

251. માહિતીનો અધિકાર અધિનિયમ ક્યા વર્ષથી અમલમાં આવ્યો?
A)2001 B)2003 C)2005 D)2006

252. જાહેર માહિતી અધિકારીને માહિતી મેળવવા માટે અરજી કરતી વખતે અરજદાર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી?
A)અરજી ફી ભરવી
B)અરજી માટેનું કારણ જણાવવું
C)પોતાનું નામ સરનામું લખવું
D)અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી

253. ICDS યોજનામાં સૌથી પાયાનો કાર્યકર કોણ છે ?
A)આંગણવાડી સુપરવાઈઝર B)આંગણવાડી વર્કર
C)ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર
D)તલાટી કમ મંત્રી

254. ક્યા વર્ષથી ICDS યોજના સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી ?
A)2001-02 B)2003-04 C)2005-06 D)2008-09

255. ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDS) ભારતમાં સૌથી પહેલા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?
A)ગુજરાત B)કર્ણાટક C)આંધ્રપ્રદેશ D)તમિલનાડુ

256. અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે?
A)પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના
B)માનવ ગરિમા યોજના
C)મા જશોદા યોજના
D)ડૉ.પી.જી.સોલંકી લોન સહાય યોજના

257. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ?
A)રૂ.10,000 B)રૂ.2,000 C)રૂ.15,000 D)રૂ.3,000

258. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-8માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ માટેની ખરીદી માટે આપવામાં આવતી સહાય કઈ યોજના દ્વારા અપાય છે ?
A)કુંવરબાઈનું મામેરૂ યોજના B)મા જશોદા યોજના
C)સરસ્વતી સાધના યોજના D)મુખ્યમંત્રી સહાય યોજના

259. કન્યાઓને મફત શિક્ષણ યોજના ક્યા વર્ષથી અમલમાં આવી ?
A)1985-86 B)1995-96 C)2000-01 D)2004-05

260. દિકરી યોજનાનો ઉદ્દેશ ક્યો છે ?
A)દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો
B)કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો
C)દિકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો
D)દિકરીઓને કન્યાદાન આપવાનો

261. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુત્તમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?
A)47,000 B)50,000 C)68,000 D)40,000

242)D, 243)C, 244)C, 245)A, 246)B, 247)D, 248)D, 249)C, 250)A, 251)C, 252)B, 253)B, 254)D, 255)C, 256)B, 257)A, 258)C, 259)A, 260)B, 261)A.

262. શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ માસિક નિભાવ ભથ્થુ કેટલા રૂપિયા આપવામાં આવે છે ?
A)700 B)1000 C)1200 D)1500

263. નીચેનામાંથી કઈ આવાસ યોજના ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો માટે ગુજરાત સરકારે જાહેર કરી છે ?
A)સરદાર આવાસ યોજના B)ઈન્દિરા આવા યોજના
C)રાજીવ ગાંધી આવાસ યોજના D)મહાત્મા ગાંધી આવાસ યોજના

264. તીર્થગ્રામ યોજના મુજબ ક્યુ ગામ તીર્થગામ તરીકે જાહેર થઈ શકે ?
A)છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
B)છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
C)છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ
D)છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.

265. રાજ્ય સરકાર તરફથી અપાતી નિરાધાર વૃદ્ધોને આર્થિક સહાય અંતર્ગત માસિક કેટલા રૂપિયાની સહાય મળે છે ?
A)200 B)400 C)500 D)1000

266. વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાય તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?
A)તીર્થગ્રામ યોજના B)પંચવટી યોજના
C)કુંવરબાઈનું મામેરું D)જ્યોતિગ્રામ યોજના

267. ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા બાળકોને મદદ કરવા કઈ હેલ્પલાઈન શરૂ કરી છે ?
A)1098 B)181 C)100 D)101

268. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
A)આરોગ્ય B)પરિવાર કલ્યાણ
C)શિક્ષણ D)સમાજ સેવા

269. માતા શબરી યોજના હેઠળ BPL મહિલાઓને ગેસ કનેક્શન માટે રૂ........ની સહાય કરવામાં આવે છે.
A)1,100 B)1,200 C)1,300 D)1,500

270. 'બેટી હૈ અનમોલ' યોજના અંતર્ગત પહેલી બે છોકરીઓને ધો.......... સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
A)10 B)11 C)12 D)05

271. મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં પુત્રીના લગ્ન વખતે રૂ........ની સહાય મળે.
A)20,000 B)25,000 C)30,000 D)35,000

272. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણમાં શિક્ષણ, આરોગ્ય અને આવાસને કેવી સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે ?
A)સામાજિક સેવાઓ B)સામાજિક વીમો
C)પ્રગતિશીલ વેરા D)ગરીબી નિવારણના કાર્યક્રમો

273. ICPS એટલે શું ?
A)ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ
B)ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી
C)ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ
D)ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ

274. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામીણ કુટુંબને કુટુંબદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કેટલા દિવસની રોજગારી આપી શકાય ?
A)120 B)90 C)105 D)100

GPSC Class - 2 - 5/3/2017

275. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે ?
A)નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો
B)નબળા વર્ગના વિદ્યાર્થીઓ
C)નાણાસંસ્થાઓને મુડી આપવા
D)ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે.

GPSC Class - 2 - 11/12/2016

276. ગુજરાત રાજ્યમાં ઈ ગવર્નન્સ પોલિસી ક્યા સમય માટે બનાવવામાં આવેલી છે ?
A)2014-2019 B)2015-2020
C)2011-2021 D)2000-2020

277. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ક્યારથી અમલમાં છે ?
A)2008 B)2009 C)2010 D)2011

GPSC Class - 2 - 05/02/2017

278. 'ઉન્નત ચૂલા અભિયાન' માટે ક્યુ મંત્રાલય સંબંધિત છે?
A)નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય
B)વિદ્યુત મંત્રાલય
C)પર્યાવરણ, વન અને આબોહવાકીય ફેરફાર (Climate Change) મંત્રાલય
D)ઉપર પૈકી એકપણ નહી

262)D, 263)A, 264)C, 265)B, 266)B, 267)A, 268)A, 269)C, 270)A, 271)B, 272)A, 273)C, 274)D, 275)A, 276)A, 277)B, 278)A.

279. "સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર" પ્રોગ્રામ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે?
A) પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય
B) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
C) પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
D) ઉપર પૈકી એકપણ નહી

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

280. જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી?
A) પાંચમી B) આઠમી C) સાતમી D) નવમી

281. ઉજ્જવલા યોજનાનો હેતુ શું છે?
A) મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું.
B) બીપીએલ પરિવારોને એલપીજી કનેકશન આપવું.
C) બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું
D) શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો.

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

282. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે ક્યો નવો શબ્દ પ્રયોજ્યો છે ?
A) અપંગ B) વિકલાંગ C) ભવ્યાંગ D) દિવ્યાંગ

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

283. તાલીમ અને મુલાકાત યોજનાનો મુખ્ય હેતુ શું હતો ?
A) સંશોધન માટેની બાબતો ઓળખવી.
B) કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું.
C) આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી.
D) વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું.

284. કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ?
A) 5115 B) 1515 C) 1551 D) 5151

285. ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ?
A) 2000 B) 2004 C) 2005 D) 2014

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

286. 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ?
A) 16 જાન્યુઆરી, 2015 B) 16 જાન્યુઆરી, 2016
C) 16 જાન્યુઆરી, 2013 D) 16 જાન્યુઆરી, 2014

287. મહિલાઓના માર્ગદર્શન કે મદદ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર કયો છે ?
A) 108 B) 138 C) 181 D) 101

GSSSB મિકેનિક - 2017

288. ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ક્યો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?
A) ઈ-ગ્રામ B) સ્વાગત
C) નિર્મલ ગ્રામ D) એકપણ નહીં

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

289. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલ ઝડપી નિર્ણયો અંતર્ગત પાટનગર ગાંધીનગરના રેલવે સ્ટેશનને રીડેવલપ અને આધુનિક બનાવવા માટે કઈ કંપનીની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ?
A) ગાંધીનગર રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ ઈન્ટીગ્રેટેડ કંપની લી.
B) ગાંધીનગર રેલવે સ્ટેશન ઈન્ટીગ્રેટેડ પ્રોજેક્ટર કંપની લી.
C) ગાંધીનગર રેલવે સ્ટેશન ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ કંપની લી.
D) ગાંધીનગર રેલવે સ્ટેશન ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કંપની લી.

મુખ્ય સેવિકા - 8/1/2017

290. આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ?
A) નંદઘર B) યશોદા ઘર C) કૃષ્ણકુટીર D) શિશુકુટીર

291. સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
A) સગર્ભા B) કિશોરી C) કિશોર D) ધાત્રીમાતા

292. માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ?
A) મા કાર્ડ B) કૃપા કાર્ડ
C) મમતા કાર્ડ D) આઈ.એસ.સી.કાર્ડ

293. મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ?
A) બાલ સેવા કેન્દ્ર B) બાલ શક્તિમ્ કેન્દ્ર
C) બાળ સંજીવની કેન્દ્ર D) બાળ આરોગ્ય કેન્દ્ર

294. કિશોરીઓને લોહતત્ત્વની ગોળી આપવા માટે ક્યો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ?
A) સોમવાર B) મંગળવાર C) બુધવાર D) ગુરુવાર

295. આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?
A) દર છ માસે B) દર ત્રણ માસે C) દર વર્ષે D) દર ત્રણ વર્ષે

279)C, 280)C, 281)B, 282)D, 283)D, 284)C, 285)C, 286)B, 287)C, 288)B, 289)C, 290)A, 291)B, 292)C, 293)C, 294)C, 295)C.

296. કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
A) સગર્ભા B) બી.પી.એલ.સગર્ભા
C) બાળક D) કિશોરી

297. બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે ક્યા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?
A) બાલ દિવસ B) વાત્સલય દિવસ
C) કિશોરી દિવસ D) મમતા દિવસ

298. ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ?
A) ઉજાલા યોજના B) પ્રકાશયુક્ત યોજના
C) જ્યોતિ યોજના D) જનધન યોજના

299. સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ?
A) ચાર B) પાંચ C) છ D) સાત

300. સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમમાં વિટામિન એ બાળ એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં ક્યા મહિનાઓમાં આપવામાં આવે છે ?
A) જાનુયઆરી જૂન B) ફેબ્રુઆરી અને ઓગસ્ટ
C) માર્ચ અને સપ્ટેમ્બર D) એપ્રિલ અને મે

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

301. મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ-સી ની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ?
A) 3 % B) 4 %
C) 2 % D) આવી કોઈ યોજના નથી

302. ભુખમરો અને કુપોષણથી થતાં મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યકિત/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
A) અન્નપૂર્ણા યોજના B) કુપોષિત - પોષણ યોજના
C) પોષણ વરદાન યોજના D) અન્નબ્રહ્મ યોજના

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

303. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?
A) રાજપીપળા B) મોઢેરા C) તલોદ D) ઉના

304. પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતુ ખોલાવી શકે છે ?
A) 10 વર્ષ B) 12 વર્ષ C) 18 વર્ષ D) 20 વર્ષ

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017

305. ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવેલ માર્કેટ યાર્ડ APMC (એ.પી.એમ.સી.)નું પૂરું નામ જણાવો.
A) એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી
B) એગ્રીકલ્ચરલ પ્રોડક્ટસ કમિટી
C) એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરીંગ કમિટી
D) એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી

HTAT - 2014

306. સરસ્વતી યાત્રા યોજના સંબંધિત છે ? : નિરંતર શિક્ષણ
307. કોલેજના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને બહુપરિમાણીય બનાવવા કઈ યોજના ગુજરાતમાં અમલી છે ? : સપ્તધારા
308. શાળા દરમિયાન શાળામાં ન આવી શકતા બાળકો માટે કઈ શિક્ષણ વ્યવસ્થા છે ? : વૈકલ્પિક શાળા
309. ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓ ક્યા ખાતા હેઠળ ચાલે છે? - સમાજ કલ્યાણ ખાતું

ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - 2017

310. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ક્યા ક્ષેત્રને મળનાર છે ? - સમગ્ર ભારત

પ્રોબેશન ઓફિસર - 2016

311. રાષ્ટ્રીય એન્ટિમેલેરિયા કાર્યક્રમ તરીકે જાણીતો રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ ક્યા વર્ષથી અમલમાં છે ? - 2004
312. એસ.જી.એસ.વાય.નું પુરુ નામ જણાવો. - સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

313. નવાં ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા ક્યુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? - સ્ટાર્ટ અપ ઈન્ડિયા

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2015

314. અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? - 22.5 કિ.મી.
315. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઈન... - 181

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

316. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-2009 ક્યા પ્રકારની પ્રાથમિક શાળાઓને લાગુ પડે છે? - બધા પ્રકારની શાળાઓને

296)B, 297)A, 298)A, 299)B, 300)B, 301)C, 302)D, 303)B, 304)A, 305)A.

317. એસ.એસ.સી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? - **પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના**

જૂનિયર કલાર્ક પેપર - 1 - 2012

318. ગુજરાતમાં રોકાણ કરવા ઉદ્યોગકારોને પ્રેરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ના નામે કાર્યક્રમ યોજવામાં આવે છે તે ક્યારે યોજવામાં આવે છે ? - **દર બે વર્ષે જાન્યુઆરીમાં**

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી - 2011

319. યુનિક આઈડેન્ટીફિકેશન નંબર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ? - **રંજના સોનવણે**

નાયબ મામલતદાર/DY.S.o - 2015

320. ઊર્જા ક્ષેત્રે 'ગુજરાતની જ્યોતિગ્રામ યોજના' જેવી યોજના ભારતમાં ક્યા નામથી રજૂ થઈ છે ? - **દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના**

321. 18 નવેમ્બર, 2014માં શરૂ થયેલી 'કિસાન વિકાસ પત્ર'માં કેટલા સમયમાં રોકાણ કરેલ રકમ બમણી થશે ? - **100 માસ**

322. મંદબુદ્ધિ અને શારિરીક ખોડખાંપણ ધરાવતા યુવક-યુવતિઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની...............યોજના અમલમાં છે. - **ઉમંગ**

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

323. કુટુંબમાં મુખ્ય કમાઉ વ્યક્તિના અવસાન પ્રસંગે આપવામાં આવતી નાણાંકીય સહાયને શું કહેવામાં આવે છે ? - **સંકટ મોચન યોજના**

324. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે જેમાં SWAGAT એટલે ? - **State Wide Attention on Grivences by Appication of Technology**

325. ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ ક્યા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ? - **પ્રવાસન ઉદ્યોગ**

326. રાજ્ય સરકારનો 'ગુણોત્સવ' કાર્યક્રમ એટલે......... - **પ્રાથમિક શાળામાં શિક્ષણનું માપદંડ**

327. રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં પાયાની ખૂટતી સુવિધાઓ પુરી પાડવાની એક નવી પહેલ એટલે .... - **વનબંધુ કલ્યાણ યોજના**

328. BRTSને શું નામ આપેલું છે ? - **જન માર્ગ**

329. ગુજરાત રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન અંતર્ગત A.T.V.T એટલે...... - **આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો**

330. યુવાનોને સ્વાવલંબી બનાવવા તેમજ તેઓમાં ઉદ્યોગ સાહસિક્તાનો વિકાસ કરવા સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ 'બેન્કેબલ લોન વ્યાજ સહાય યોજના' એટલે ? - **પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના**

331. કારીગરોના સ્વાવલંબન માટે શરૂ કરવામાં આવેલ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા કોને લાભ આપવામાં આવશે ? - **હાથસાળ કે હસ્તકળાની કારીગરીની જાણકાર વ્યક્તિ**

332. ગુજરાત સરકારે સ્થાપેલી સ્વાયત્ત સંસ્થા eMPEX-b એટલે ? - **એમ્પ્લોયમેન્ટ એક્સટેન્શન બ્યુરો**

TET- I - 2012/2014

333. 'બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ' આ કઈ નીતિનું સુફળ છે ? - **રાષ્ટ્રીય શિક્ષણ નીતિ**

સબ ઓડિટર - 2015

334. ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે .... યોજના અમલમાં મૂકી છે. - **વિદ્યાલક્ષ્મી બોન્ડ**

335. જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે ? - **સગર્ભા સ્રીને પ્રસૂતિ સહાય**

336. રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ? - **ગ્રામમિત્ર યોજના**

337. ગુજરાત સરકારના 'ઈ-મમતા' પ્રોગ્રામનો હેતુ શું છે ? - **માતા અને બાળ મરણ અટકાવવું**

338. આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ? - **માતા યશોદા**

સબરજિસ્ટ્રાર - 2013

339. GSWANનું આખું નામ શું છે ? - **ગુજરાત સ્ટેટ વાઈડ એરીયા નેટવર્ક**

HTAT - 2012

340. પોકાર અભિયાન શા માટે શરુ કરવામાં આવ્યું ? - **HIV અંગેની ગેરમાન્યતા દૂર કરવા માટે**

PSI - 2012

341. ગુજરાત સરકારના ઈ-મમતા પ્રોગ્રામના હેતુ શું છે ? - **માતા અને બાળ મરણ અટકાવા**

PSI નશાબંધી - 2011

342. ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના મુકવામાં આવી છે ? - વિદ્યાલક્ષ્મી બોન્ડ

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

343. પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં કેટલા સમય સુધી ખાતામાં સંતોષજનક લેવડ-દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે ? : **6 મહિના**

344. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કેટલા રૂપિયા સુધીની શિશુ લોન આપવામાં આવે છે? : **રૂ. 50,000**

345. એપ્રિલ 2018માં રાષ્ટ્રીય ગ્રામ સેવા યોજનાની શરૂઆત થઈ જેના દ્વારા ...... - **દેશભરમાં પંચાયત રાજ વ્યવસ્થાને મજબૂત બનાવાશે.**

346. ઓપરેશન સ્વર્ણ ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? - **રેલવે મંત્રાલય**

347. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયાપુર અને નાગેપુર પછી..........ને ત્રીજા ગામડા તરીકે દત્તક લીધું. - **કાકરાહિયા**

348. સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? : **40 ટકા**

349. ગુજરાતનું દ્વિતીય રાજ્ય નાણાં પંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું. : **2005-10**

350. ઈ-સનદ યોજનાનો હેતુ...... - **રૂબરૂ સંપર્ક વિના પણ દસ્તાવેજ માટે કેન્દ્રકૃત મંચ પૂરુ પાડવાનો છે.**

351. નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેના ગુજરાત સરકારના 'સ્વાગત' પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ ? : **2003**

352. રાજ્ય સરકાર દ્વારા 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધો કે જેઓ રાષ્ટ્રીય નિરાધાર વૃદ્ધો માટેની પેન્શન યોજના હેઠળ પેન્શન મળવાપાત્ર હોય પરંતુ પેન્શન મળતું નથી તેવા નાગરિકોને વિનામૂલ્યે માસિક ઘઉંનું વિતરણ કરવા કઈ યોજના અમલમાં મૂકેલ છે ? : **અન્નપૂર્ણા**

353. કેન્દ્ર સરકાર સૌના માટે ઘરનું ધ્યેય........વર્ષ સુધીમાં હાંસલ કરવાનું લક્ષ્ય સેવે છે. - **2022**

354. ગુજરાત સરકાર દ્વારા કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ક્યા નાણાંકીય વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? : **2003-2004**

355. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અનુસાર ગુજરાત રાજ્ય સાથે ક્યા રાજ્ય વચ્ચે પ્રવાસીઓને અને લોકોના આદાન-પ્રદાન માટે રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા ? : **છત્તીસગઢ**

356. વિદેશ મંત્રાલયની કઈ યોજનાનો હેતુ ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાનો છે ? - **સ્ટડી ઈન ઈન્ડિયા**

357. વ્યાજમાં આર્થિક સહાય યોજનામાં ટુંકાગાળાની લોન કેટલા ટકાના વ્યાજે અપાશે ? - **4%**

358. કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ? : **રૂ. 30,000/-**

359. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? : **રૂ. 75,000/-**

360. રાષ્ટ્રીય કૌશલ વિકાસ યોજનાનું લક્ષ્ય..........કૌશલ્ય પ્રદાન કરવાનું છે. - **2022 સુધીમાં 500 મીલીયન લોકોને**

361. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને લોકસ્વીકૃત બનાવવા ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2002માં ક્યા બોર્ડની રચના કરવામાં આવી હતી ? - **ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ**

362. ડિજિટલ લિટરસી માટે ભારત સરકારે ક્યો કાર્યક્રમ હાથ ધર્યો છે ? - **PMGDISHA**

363. ભારત સરકાર કઈ યોજના દ્વારા દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના હિસ્સામાં વધારો કરશે ? - **સ્ટડી ઈન ઈન્ડિયા**

364. ડિજિ લૉકર અંતર્ગત નાગરિકને કઈ બાબત વડે આગવી ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ મળે છે ? - **આધાર નંબર**

365. કઈ જાતિના વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ માટે શરૂ કરાયેલ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં નિઃશુલ્ક તાલીમ અપાય છે ? - **આદિજાતિ**

366. સીસીટીએનએસ..........ને લગતી પોલીસ નેટવર્ક સીસ્ટમ છે. - **ક્રાઈમ (ગુનો) અને ક્રિમીનલ (ગુનેગાર) ટ્રેકિંગ નેટવર્ક અને સીસ્ટમ**

367. સમૂહ માટેની પાણી પુરવઠા યોજના કઈ છે ? - **ન્યૂ સ્વજલ પ્રોજેક્ટ**

368. સરકારને માહિતી અધિનિયમની રચના કરવા કઈ બિનસરકારી સંસ્થાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ? - **મજદૂર કિસાન શક્તિ સંગઠન**

369. ATMAનું પૂરું નામ આપો. - **એગ્રિકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી**

370. ગુજરાત સરકારની SWAGAT ઓનલાઈનની શરૂઆતનો હેતુ.... - **સરકારના વિવિધ સ્તરે નાગરિકોની ફરિયાદોના અસરકારક, પારદર્શક અને ઝડપી નિરાકરણ માટે છે.**

371. પેમેન્ટ ગેટ વે કઈ બાબત સાથે સંબંધિત છે ? - **ઈ-કોમર્સ**

372. ઈલેક્ટ્રોનિક ડિલિવરી ઓફ સર્વિસને શું નામ અપાયું છે ? - **ઈ-ક્રાંતિ**

373. ભૌતિક દસ્તાવેજોનો વપરાશ દૂર કરી ડિજિટલ દસ્તાવેજો ગમે તે સમયે, ગમે તે જગ્યાએ ઉપલબ્ધ કરાવી ઓનલાઈન સહભાગી થવાની યોજના જણાવો. - **ડિજિલોકર**

374. નોન ફાર્મ સેક્ટરમાં રોજગારી ઉભી કરવી તે કઈ યોજનાની મુખ્ય બાબત છે ? - **પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ**

375. શિક્ષકોની વ્યવસ્થા અને તાલીમનું કાર્ય કઈ યોજના કરે છે ? - **સર્વ શિક્ષા અભિયાન**

376. કઈ જાતિના વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ માટે શરૂ કરાયેલ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં નિઃશુલ્ક ટુલકીટ, રહેવાજમવાની સુવિધા અપાય છે ? - **આદિજાતિ**

377. કઈ સુવિધામાં ઈ-સાઈન સુવિધાનો ઉપયોગ કરી નાગરિકો જાતે દસ્તાવેજો અપલોડ કરી તેને ડિજિટલી સાઈન કરી શકે છે ? - **ડિજિલોકર**

378. સરકારે ક્યા રસાયણનો તેના કેન્સરને લગતા ગુણધર્મોને કારણે ખાદ્ય ઉમેરણ તરીકે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ? - **પોટેશીયમ બ્રોમેટ**

379. પ્રોજેક્ટ ચમન કઈ બાબત સાથે સંબંધિત છે ? - **બાગાયતી પાકની આકારણી અને સંચાલન**

380. ઓટોમોબાઈલ વિશ્વમાં નેબ્યુલા યોજના શું છે ? - **એ એસ્ટન માર્ટીન અને રેડબુલ દ્વારા સુપર કારની ડિઝાઈન વિશે છે.**

381. નેશનલ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક (NoFN) યોજનાનો આશય જણાવો. - **બધી જ 2,50,000 પંચાયતોને નેટવર્ક જોડાણ આપવું**

382. ઈન્ટેલિજન્સ અને સલામતી સંસ્થાઓને માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈ લાગુ પડતી નથી તે કઈ કલમ છે ? - **કલમ-24**

383. તાજેતરમાં ....રોગ માટે અમિતાભ બચ્ચનની WHOના ગુડવીલ એમ્બેસેડર તરીકે નિમણૂક થઈ છે ? **હીપેટાઈટીસ**

384 BPL આદિજાતિ કુટુંબોની આવક વધારવા આદિજાતિ મહિલા પશુપાલક માટેની યોજનામાં કુલ કેટલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે ? - **સાત**

385. વિકલાંગોને સમાન હક આપતા બિલ રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી બિલમાં સેરેબ્રલ પાલ્સીના દર્દીનો સમાવેશ થાય છે, આ વિધાન? - **સાચું છે.**

386. પોષણ અભિયાનનું સંકલન અને તેની કોણ ચલાવે છે ? - **મહિલા અને બાળ વિકાસ મંત્રાલય**

387. કારખાનામાં કામ કરતા અને અપૂરતું કૌશલ્ય ધરાવતા તથા પરંપરાગત કૌશલ્ય ધરાવનાર શ્રમિકોને ખૂટતા કૌશલ્યની પ્રાપ્તિ માટે કઈ સ્કીમ હેઠળ આવરી લેવાયા છે ? - **શ્રમ મંત્રાલયની મોડ્યુલ એમ્પ્લોયેબલ સ્કીમ**

388. ગુજરાત ગ્રામ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ કોના હિત માટે કાર્યરત્ છે ? - **કામદારોના**

389. ગુજરાત મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના વિશે જણાવો. - **ઉચ્ચ અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની યોજના**

390. પ્રાથમિક શાળાઓ માટે ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર યોજના જણાવો. - **સર્વ શિક્ષા અભિયાન**

391. કઈ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા કામદારોને ખૂટતું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે આવરી લેવાયા છે ? - **મોડ્યુલ એમ્પ્લોયેબલ સ્કીમ**

392. ક્યો વૈશ્વિક સહયોગી નીતિ આયોગની સાથે 'સાથ' યોજના ઉપર કાર્ય કરે છે ? - **મેકેન્ઝી એન્ડ કંપની**

393. વિકલાંગોને સમાન હક આપતા બિલ રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી બિલમાં થેલેસેમિયાના દર્દીનો સમાવેશ થાય છે, આ વિધાન? - **સાચુ છે.**

394. ભારત અને નેપાળના વડાપ્રધાને મે 2018માં શરૂ કરેલ બસ ક્યા સુધી ચાલશે ? - **જનકપુરીથી અયોધ્યા**

395. અમદાવાદ ખાતે આવેલ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન કોના કલ્યાણ માટે કાર્યરત્ છે ? - **કામદારોના**

396. ગુજરાત સમગ્ર વિશ્વભરના પ્રમુખ નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, નિયમનકારો અને પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરવાની તક પૂરી પાડે છે.... - **વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ**

397. ક્યા અભિયાન હેઠળ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ઊભી કરવા ફંડ અપાય છે ? - **RMSA (રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન)**

398. માતા યશોદા ગૌરવ (વિમા) નિધિ યોજના કોના માટે છે ? - **આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી હેલ્પર્સ**

399. કઈ યોજના હેઠળ શાળાકીય શિક્ષણ અધવચ્ચેથી છોડી જનારા ઉમેદવારોને કૌશલ્ય પ્રાપ્તિ માટે આવરી લેવાયા છે ? - **મોડ્યુલ એમ્પ્લોયેબલ સ્કીમ**

400. ઊર્જા મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ એનર્જી એફીસીયન્સી સર્વિસીસ લીમિટેડ (EESL)એ ....દેશમાં તાજેતરમાં ઉજાલા યોજના શરૂ કરી. - **મલેશિયા**

401. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કોના કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરે છે ? - **કામદારોના**

402. સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દર્પણ-PLI........માં મદદરૂપ થશે. - **બંને PLI અને RPLIનું પ્રીમિયમ એકત્રિત કરવા.**

403. જનની સુરક્ષા યોજના ક્યા ખાતાના NRHM (નેશનલ રુરલ હેલ્થ મિશન) હેઠળ સલામત માતૃત્વ સંબંધી છે ? - **આરોગ્ય ખાતા**

404. ગુજરાતમાં ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓ અને તેમના પરિવારને ગંભીર રોગની સારવાર માટે વાર્ષિક કેટલા રૂપિયા સુધીની કેશલેસ તબીબી સહાય આપવાનો નિર્ણય થયો છે ? - **રૂ.2 લાખ**

405. e-RaKAM પોર્ટલ શું છે ? - **કૃષિ ઉત્પાદો વેચવાનું પ્લેટફોર્મ છે**

406. સરકાર દ્વારા નોનગેસ રેશનકાર્ડ પર વ્યક્તિદીઠ માસિક ધોરણે કેટલા લિટર ઘરગથ્થુ વપરાશ માટે ભૂરા રંગનું કેરોસીનનું વિતરણ થાય છે ? - **2 લિટર**

407. વિકલાંગોને સમાન હક આપતા બિલ રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી બિલમાં એસીડ હુમલાનો ભોગ બનનારનો સમાવેશ થાય છે, આ વિધાન? - **સાચુ છે.**

408. લકી ગ્રાહક યોજના અને ડિજિધન વ્યાપાર યોજનાનું અમલીકરણ કોણ કરે છે ? - **નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા**

409. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ કઈ રીતે સ્થાપવામાં આવેલું છે ? - **કાયદા દ્વારા**

410. ભારત સરકારે ઉમંગ એપ..... માટે પ્રસ્તુત કરી છે. - **પેન્શનરો**

411. બાલીકા મંચ, વિદ્યાર્થિનીઓ માટે જાજરૂની અલગ સુવિધા અને કસ્તુરબા ગાંધી બાલ વિદ્યાલય કઈ સરકારી યોજનાનો ભાગ છે ? - **બેટી બચાવો, બેટી પઢાઓ યોજના**

412. કોના કલ્યાણ માટેની તમામ યોજનાઓનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે એવું બંધારણ સુનિશ્ચિત કરે છે ? - **અનુસૂચિત જનજાતિઓ**

413. કિશોરી શક્તિ યોજના, બાલિકા સમૃદ્ધિ યોજના, એડોલસન્ટ એનીમિયા પ્રોગ્રામ કઈ યોજનામાં સમાવિષ્ટ છે ? - **સંકલિત બાળ વિકાસ યોજના**

414. 10 વર્ષ સુધીની ઉંમરની બાળકીના નામે ખાતું ખોલી આપતી યોજના જણાવો. - **સુકન્યા સમૃદ્ધિ યોજના**

415. ભારતના બંધારણ અને UN કન્વેન્શન ઓન ધ રાઈટ્સ ઓફ ચાઈલ્ડને ધ્યાને રાખી..........એ કામગીરી કરવાની છે. - **નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ**

416. ક્યા પાડોશી દેશ સાથે ભારતે એપ્રિલ 2018માં જહાજી વ્યવહાર માટે અંતર્દેશીય જળમાર્ગ વિકસાવવા સંમત થયું ? - **નેપાળ**

417. જ્યોતિગ્રામ યોજનાનો સફળતાપૂર્વક અમલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ક્યું છે ? - **ગુજરાત**

418. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલી બાળકીઓની મર્યાદામાં ખાતું ખોલાવી શકાય ? - **બે (જોડીયા બાબાના કિસ્સામાં 3)**

419. પાવર ટેક્સ ઈન્ડિયા યોજના ક્યા ક્ષેત્ર માટે બનાવાઈ છે? - **પાવરલૂમ ક્ષેત્ર**

420. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ક્યા વર્ષે શરૂ કરાઈ ? - **2015**

421. માહિતી અધિકાર અધિનિયમ-2005 મુજબ અરજીની તારીખથી 30 દિવસમાં માહિતી પૂરી પાડવી જરૂરી છે, તેમાં ગણતરીમાં રજાના દિવસોનો ? - **સમાવેશ થાય છે.**

422. જેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી અને ઉછેરી શકે એવા નેતાઓને જોતરવા માટેની વ્યૂહાત્મક રાષ્ટ્ર નિર્માણની પહેલ 'મેન્ટર ઈન્ડિયા કેમ્પેઈન'............દ્વારા શરૂ કરવામાં આવી. - **નીતિ આયોગ**

423. ચાઈલ્ડ રાઈટના ભંગના કિસ્સામાં ક્યુ કમિશન પગલા લઈ શકે છે? - **નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ**

424. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કેટલા વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય છે ? - **18થી 50 વર્ષની વય જૂથ**

425. UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ કેટલા માર્ગ અને વિમાની મથકોને આવરી લીધેલ છે ? - **128 માર્ગ અને 80 વિમાની મથક**

426. ધૂપ યોજનાનો હેતુ ....- **બાળકોમાં વિટામીન ડીની ઉણપને સમૃદ્ધવા માટે**

427. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ ક્યા વર્ષ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની યોજના છે ? - **2022**

428. ગુજરાતમાં સૌની યોજનાનું ઉદ્ઘાટન કોણે કરેલું છે ? - **માન. પ્રધાનમંત્રીજી**

429. નીચલી અદાલતોમાં કેસોના આખરીકરણમાં થતા વિલંબ પર દેખરેખ રાખવા જ્યુડિશીયલ પરફોરમન્સ ઈન્ડેક્સની સ્થાપના કરવાનું સૂચન કોણે કર્યું છે ? - **નીતિ (NITI) આયોગ**

430. ભારતના વિવિધ ભાગોમાં આજિવિક અને કૌશલવિકાસ મેળવવાનું આયોજન........ના ભાગરૂપે થયું હતું ? - **ગ્રામ સ્વરાજ અભિયાન**

431. લક્કી ગ્રાહક યોજના કઈ બાબતની પ્રોત્સાહક યોજના છે ? - **ડિજિટલ લેવડ-દેવડ**

432. સ્વયં પ્રભા શું છે ? - **એક ઉચ્ચ પ્રકારનો શૈક્ષણિક પ્રોગ્રામ**

433. ......તમામ રેકોર્ડ માહિતી મેળવવાના અધિકારને સુવિધાપૂર્ણ બનાવે અને તેવા સ્વરૂપમાં જાળવવા જોઈએ. - **જાહેર સત્તા મંડળે**

434. ડિજિટલ લેવડ-દેવડ પ્રોત્સાહક યોજનામાં માત્ર ક્યા વિસ્તારના ટ્રાન્ઝેક્શનોનો સમાવેશ થાય છે? - **ગ્રામીણ વિસ્તારના**

435. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના મુજબ મહત્તમ લોન મર્યાદા કેટલી છે ? - **રૂ.1 કરોડ**

436. ભારત સરકારની કઈ યોજના કઠોળ અને તેલિબિયાના ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસની અપેક્ષા રાખે છે ? - **કૃષિ વિકાસ યોજના**

437. ઉડાન યોજના હેઠળ ક્યા વિસ્તારને આવરી લેવાનો હેતુ છે ? - **ક્ષેત્રીય વિસ્તાર**

438. સૌની યોજનાથી કઈ નદીના પાણી દ્વારા રાજકોટ, જામનગર અને મોરબીના જળાશયોમાં પાણી ભરવામાં આવશે ? - **નર્મદા નદી**

439. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાયંધરી કાયદા મુજબ ગરીબ કુટુંબમાંથી કામ કરી શકે તેવા એક સભ્યને વર્ષમાં ઓછામાં ઓછા દિવસની રોજગારી પૂરી પાડવાનો ઉદ્દેશ છે ? - **100 દિવસ**

440. કોલસા મંત્રાલયે કોલસાનું નિયંત્રણ કરતા લોકો અને કોલસાની ગુણવત્તા નિરીક્ષણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા કઈ એપ્લિકેશનની શરૂઆત કરી છે ? - **UTTAM**

441. વેપારીઓ માટે ડિજિટલ લેવડ-દેવડની પ્રોત્સાહક યોજના કઈ છે ? - **ડિજિધન વ્યાપાર યોજના**

442. ખેલો ઈન્ડિયા યોજના સંદર્ભે શ્રેષ્ઠ ખેલાડીને વાર્ષિક કેટલી સંવર્ધન સહાય સળંગ 8 વર્ષ સુધી મળશે ? - **રૂ.5 લાખ**

443. ભારત સરકારની કઈ યોજના ઘાસચારાના ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસની અપેક્ષા રાખે છે ? - **કૃષિ વિકાસ યોજના**

444. ડિજિટલ માળખું ઘડવું તે ક્યા કાર્યક્રમનો મુખ્ય અંગભૂત ઘટક છે ? - **ડિજિટલ ઈન્ડિયા**

445. શૈક્ષણિક કાર્યક્રમ સ્વયં પ્રભા કેટલી DTH ચેનલ પર પ્રસારિત થાય છે ? - **32**

446. 'ભારત વિશે જાણો' કાર્યક્રમ ક્યા મંત્રાલય દ્વારા ડાયસ્પોરા જોડાણ માટેની મુખ્ય પહેલ છે ? - **વિદેશ મંત્રાલય**

447. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનાનો હેતુ જણાવો. - **પછાત વર્ગો અને મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતા લાવવા**

448. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાયંધરી કાયદામાં લાભાર્થીમાં ઓછામાં ઓછા કેટલા ટકા મહિલાઓ હોવી જોઈએ ? - **33%**

449. સૌની યોજનામાં પ્રથમ ચરણમાં કેટલા રૂપિયાના ખર્ચનો અંદાજ છે ? - **રૂ.12,000 કરોડ**

450. ભારત સરકારની કઈ યોજના ભારતના વર્ષા આધારિત વિસ્તારોના વિકાસની અપેક્ષા રાખે છે ? - **કૃષિ વિકાસ યોજના**

451. સ્વયં પ્રભા કાર્યક્રમ કેટલી કલાક માટે પ્રસારિત થાય છે ? - **24 કલાક**

452. માહિતી અધિકાર મુજબ ઈ-મેઈલથી માહિતી માંગવામાં આવી હોય તો અરજી ફી કેટલા દિવસમાં ભરવાની હોય છે ? - **સાત કેલેન્ડર દિવસમાં**

453. માહિતી અધિકાર મુજબ ....કમ્પ્યૂટરાઈઝ્ડ કરવા ઉચિત હોય તેને વાજબી સમયમાં કમ્પ્યૂટરાઈઝ્ડ કરવા જોઈએ. - **જાહેર સત્તા મંડળે**

454. માહિતી અધિકાર મુજબ ઈ-મેઈલથી માહિતી માંગવામાં આવી હોય તો BPLનો પુરાવો કેટલા દિવસમાં આપવાનો હોય છે? - **7 કેલેન્ડર દિવસમાં**

455. માહિતી અધિકાર મુજબ માહિતી મેળવવાની અરજીનો સ્વીકારવાનો ઈનકાર કરે તો ? - **દંડની જોગવાઈ છે.**

456. ભારત સરકારની કઈ યોજના કેસરની ખેતી ક્ષેત્રમાં વિકાસની અપેક્ષા રાખે છે ? - **કૃષિ વિકાસ યોજના**

457. માહિતી અધિકાર મુજબ ઈ-મેઈલથી માહિતી માંગવામાં આવી હોય તો અરજી ફી અને BPLનો પુરાવો 7 કેલેન્ડર દિવસમાં ન થાય તો શું થાય ? - **અરજી દફતરે કરવામાં આવે**

458. 18થી 30 વર્ષની વયજૂથના ભારતીય મૂળના નવયુવાનોને એમના મૂળ સાથે જોડવાની અને પરિચિત કરવાની પહેલ કઈ છે ? - **ભારત વિશે જાણો કાર્યક્રમ**

459. માહિતી અધિકાર હેઠળ માંગેલ માહિતી નક્કી કરેલ સમયમર્યાદામાં પૂરી ન પડાય ત્યારે ? - **દંડની જોગવાઈ છે.**

460. 26 જાન્યુઆરી, 2001ના વર્ષમાં આવેલા ભૂકંપમાં મરણ પામેલ બાળકોની યાદમાં ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરેલી છે ? - **વિદ્યાદીપ યોજના**

461. ભારત સરકારની કઈ યોજના શાકભાજી ઝુમખાઓના વિકાસની અપેક્ષા રાખે છે ? - **કૃષિ વિકાસ યોજના**

462. ખેડૂત દ્વારા ધારણ કરેલ જમીનની ગુણવત્તા અને ગુણવત્તા વધારવા માટે આપવામાં આવતા રિપોર્ટની યોજના કઈ છે ? - **સોઈલ હેલ્થ કાર્ડ**

463. પ્રગતી પ્લેટફોર્મ કઈ અદ્યતન ટેક્નોલોજીઓનું જોડાણ કરે છે ? - **જીઓસ્પેશિયલ ટેક્નોલોજી, વીડિયો કોન્ફરન્સિંગ, ડિજિટલ ડેટા મેનેજમેન્ટ**

464. SANKALP યોજનાનું પૂરું નામ આપો. - **સ્કિલ એક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવ્લીહુડ પ્રોમોશન પ્રોગ્રામ**

465. દિવ્યાંગો માટે 3% અનામતને બદલે કેટલા ટકા અનામતની જોગવાઈ થઈ ? - **4%**

466. ગુજરાતમાં સૌની યોજનાની લિંક-1 જણાવો. - **મોરબી જિલ્લાના મચ્છુ-2 બંધથી જામનગર જિલ્લાના સાની બંધ.**

467. રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને માહિતી અધિકાર અધિનિયમ, 2005માંથી બાકાત રાખેલ છે... - **સત્ય છે**

468. ટેકનિકલ એજ્યુકેશન ક્વોલિટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ક્યા મંત્રાલય હસ્તક છે ? - **માનવ સંસાધન વિકાસ મંત્રાલય**

469. કઈ યોજના અન્વયે સમગ્ર ભારતમાં 20 વિશ્વ વિદ્યાલયોને ખેલ શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવશે ? - **ખેલો ઈન્ડિયા**

470. ડિજિટલ સાક્ષરતા ક્યા કાર્યક્રમનો મુખ્ય અંગભૂત ઘટક છે ? - **ડિજિટલ ઈન્ડિયા**

471. ગુજરાતમાં સૌની યોજનાની કઈ લિંક સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગવો-2 બંધથી અમરેલી જિલ્લાના રાયડી બંધ સુધી છે ? - **લિંક-2**

472. વિદ્યાદીપ યોજનાનું વીમા પ્રીમિયમ કોણ ચૂકવે છે ? - **રાજ્ય સરકાર**

473. જમીનની આરોગ્ય પત્રક યોજના એટલે ? - **સોઈલ હેલ્થ કાર્ડ યોજના**

474. દિવ્યાંગોની અશક્તતામાં કઈ બાબતોનો સમાવેશ થાય ? - **માનસિક વિકાર, સેરિબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફટ, ક્રોનિક ન્યૂરોલોજીકલ**

475. વિદ્યાદીપ યોજના હેઠળ માન્ય શાળામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયાનું વીમા કવચ મળશે ? - **રૂ.50,000**

476. ગુજરાતની કઈ યોજનાની લિંક-3 સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા-2થી રાજકોટ જિલ્લાના વેણુ-1 બંધ સુધી છે. - **સૌની યોજના**

477. બાળકો અને સગર્ભા સ્ત્રીઓમાં રોગ પ્રતિરક્ષા વધારવા ક્યા કાર્યક્રમની શરૂઆત થઈ છે ? - **મિશન ઈન્દ્રધનુષ**

478. કઈ ભારતીય કંપનીએ 100 અબજ ડોલરનું લક્ષ સાધી ભારતીય IT વિશ્વમાં ઈતિહાસ સર્જ્યો ? - **TCS**

479. RTIના કાયદા મુજબ રેકોર્ડમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ? - **કોઈપણ દસ્તાવેજો, ફાઈલો, હસ્તલિખિત નોંધ, માઈક્રો ફિલ્મ કે અન્ય પ્રકારે બનાવેલ ફિલ્મ, કમ્પ્યૂટર પર બનાવેલ, રાખેલ માહિતી.**

480. દિવ્યાંગો સંબંધિત ભેદભાવની પરિસ્થિતિમાં કેટલા મહિનાની જેલ અને દંડ થઈ શકે ? - **6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ અને રૂ.10,000થી 5 લાખ સુધીનો દંડ**

481. ગુજરાતની સૌની યોજના હેઠળ લિંક-4નો વિસ્તાર જણાવો. - **સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાવો-2થી જૂનાગઢની હિરણ-2 સિંચાઈ યોજના**

482. કૌશલ્ય સુધારણા અને ક્ષમતા નિર્માણ તાલીમ માટે વનધન વિકાસ કેન્દ્રની સ્થાપનાનો કઈ યોજનામાં સમાવેશ થાય છે ? - **વનધન યોજના**

483. પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અકસ્માતથી થતા અવસાન માટે વિમા રક્ષણ આપવા અંગેની ''વિદ્યાદીપ'' યોજના હેઠળ કેટલી રકમનું વીમા રક્ષણ આપવામાં આવે છે ? - **રૂ. 75,000**

484. ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને રાંધેલું ભોજન પૂરું પાડે છે ? - **શ્રમિક અન્નપૂર્ણા યોજના**

485. કેન્દ્રીય માહિતી પંચની સત્તા અને કાર્યો RTI અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે ? - **18**

486. એપ્રિલ 2018માં શરૂ થયેલ GOBAR ધન યોજનાનું પૂરું નામ આપો. - **ગેલ્વેનાઈઝિંગ ઓર્ગેનિક બાયોએગ્રો રિસોર્સિસ**

487. તાજેતરમાં આકોદરા શા માટે ચર્ચામાં હતું ? - **આ ગામને પ્રધાનમંત્રી દ્વારા દેશના એકમાત્ર ડિજીટલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું**

488. મિશન ઈન્દ્રધનુષ યોજના કઈ બાબત અંગેની યોજના છે? - **સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ**

489. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા કેટલા રૂપિયામાં રાંધેલુ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે ? - **રૂ.10**

490. હાલમાં ''ભીમ એપ'' ''Bhim app'' શરૂ કરવામાં આવેલી છે તેનો મુખ્ય હેતુ શું છે ? - **ઝડપથી અને સહેલાઈથી નાણાનું ચુકવણું કરવું**

491. માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ માટેની જોગવાઈ કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે ? - **8**

492. ભારતની પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પાયો નરેન્દ્ર મોદીજીએ ....માં નાખ્યો હતો. - **ઈમ્ફાલ, મણિપુર**

493. મુખ્ય માહિતી કમિશનરનાં હોદ્દાંની મુદત માહિતીનો અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમ હેઠળ નક્કી કરવામાં આવેલી છે? - **13**

494. ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કઈ રીતે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે ? - **શ્રમિક બજારોમાં ખોરાકની નાની દુકાનો દ્વારા**

495. પેટ્રોટેક (Petrotech) કે જે એશિયામાં ઓઈલ અને ગેસ માટેનો અગત્યનો પ્રસંગ છે અને દર વર્ષે તેનું આયોજન થાય છે. આ પ્રસંગનું આયોજન કોણ કરે છે ? - **ભારત**

496. ....યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ગરીબી રેખા નીચેની સગર્ભા મહિલાઓને પ્રસૂતિ માટે ગ્રામીણ વિસ્તારમાં રૂ.700ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. - **જનની સુરક્ષા યોજના**

497. ગુજરાત તાલુકા મામલતદાર કાર્યાલયોમાં ઈ-ધારા કેન્દ્રની શું ભૂમિકા છે ? - **જમીનની વિગતોની દૈનિક પ્રવૃત્તિઓ જેમકે પરિવર્તન અને અધિકારોના હેવાલોની નોંધણી કરવી.**

498. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસની યોજનામાં લાભ મેળવવા વિદ્યાર્થીના વાલીની આવક કેટલી હોવી જોઈએ? - **50,000/- ₹ (માસીક) થી વધુ નહીં**

499. આદિવાસી મહિલા સશક્તિકરણ યોજનાનો ઉદેશ શું છે ? - **આદિવાસી મહિલાના આર્થિક ઉદ્ધાર માટે**

500. કઈ યોજના હેઠળ આદિવાસીઓની આવકમાં વધારો કરવા તેમના દ્વારા જંગલમાંથી એકત્રિત કરવામાં આવેલી પેદાશ ઉપર મૂલ્યવર્ધનની અગત્યની ભૂમિકા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? - **વનધન યોજના**

501. 3 થી 6 વર્ષના બાળકોને કઈ યોજના હેઠળ બાળપણ શિક્ષણ આપવામાં આવે છે ? - **પ્રાથમિક શિક્ષણનો સાર્વત્રિકરણ**

502. અપીલ પ્રક્રિયા માહિતી અધિકાર અધિનિયમની કઈ કલમમાં આવે છે ? - **કલમ 19**

503. માતા યશોદા પુરસ્કાર કોને આપવામાં આવે છે ? - **આંગણવાડી કાર્યકરને**

504. માહિતી અધિકાર અધિનિયમનો અમલ ક્યારથી થયો ? - **12 ઓક્ટોબર 2005 થી**

505. ગુજરાત સરકારની ઈ-ગ્રામ યોજના હેઠળ..... - **કમ્પ્યૂટર હાર્ડવેર અને સોફ્ટવેર સાથે પંચાયતના ત્રણેય સ્તરને સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે.**

506. રાજીવ ગાંધી ખેલો અભિયાન અને શહેરી ખેલ બુનિયાદી ઢાંચાની યોજનાને કઈ યોજના સાથે જોડી દેવાઈ ? - **ખેલો ઈન્ડિયા**

507. ડિજિટલી સેવાઓની ડિલિવરી ક્યા કાર્યક્રમનો મુખ્ય અંગભૂત ઘટક છે ? - **ડિજિટલ ઈન્ડિયા**

508. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અંતર્ગત 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને કેટલી સહાય આપવામાં આવે છે? - **₹ 700/-**

509. આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોમાં ભાષાકીય વિકાસ માટે કઈ પ્રવૃતિ સૌથી મહત્વની છે? - **બાળકને વાતચીત કરવા માટે પ્રોત્સાહન આપવું**

510. સમગ્ર ભારત દેશમાં લોકોનું પોષણસ્તર ઊંચું લાવવા માટે કઈ પોલીસી શરૂ કરવામાં આવી હતી ? - **નેશનલ ન્યુટ્રીશન પોલીસી**

511. સ્ત્રી ભ્રુણ ગર્ભપાતના અટકાવ માટે 2004 થી ભારતમાં કયો એકટ / કાનૂન છે ? - **પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયેગ્નોસ્ટીકસ ટેકનીકસ એકટ**

512. દિવ્યાંગ લોકોના હિત માટે કાર્ય કરતુ જૂથ કયું છે? - **કોલાબોરેટીવ રીસર્ચ એન્ડ ડીસએમિનેશન**

513. ગુજરાત કઈ બાબત મારફતે સંભવિત ભાગીદારો સાથે વૈશ્વિક સ્તરે જોડાવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસ માટે તક પૂરી પાડે છે- **વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ**

514. સગર્ભા મહિલાઓની નિઃશુલ્ક સ્વાસ્થ્ય ચકાસણી માટેની કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મૂકવામાં આવેલી યોજનાનું નામ શું છે? - **પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA)**

515. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના દેવધોલેરામાં iCreateનું ઉદઘાટન કર્યું તેનું હેતું...... - **મોટી સંખ્યામાં ગુણવત્તાવાળા એન્ટરપ્રિનિયર્સ બનાવવા.**

516. ગુજરાત સરકારની નવી રમતગમત નીતિ અનુસાર ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવનાર ખેલાડીને કેટલા રૂપિયા સરકાર તરફથી ઈનામરૂપે આપવામાં આવશે ? - રૂ.5 કરોડ

517. પ્રથમ અપીલ અધિકારીને અપીલ મળ્યા બાદ તેનો નિકાલ કેટલા દિવસમાં કરવાની જોગવાઈ છે. - **30 દિવસમાં અને જરૂર જણાયે કારણો દર્શાવીને વધુ પંદર દિવસ (45 દિવસ)**

518. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.9 લાખ સુધીની લોનના વ્યાજ ઉપર કેટલા ટકા સબસીડી આપવામાં આવે છે? - **4%**

519. ભારત સરકારનો e Biz પ્રોજેક્ટ કઈ ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવા અંગેનો છે? - **G2B સેવાઓ**

520. માહિતીનો અધિકાર અધિનિયમ 2005 ની કઈ કલમ હેઠળ સક્ષમને દંડ કરવાની સત્તા આપવામાં આવેલી છે. - **20**

521. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ક્યા વર્ષે ચાલુ કરવામાં આવી હતી ? - **1998**

522. સાંસદ સભ્યો માટેની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનામાં હાલ પ્રતિ વર્ષ કેટલા રૂપિયાનું સહાયક અનુદાન ફાળવવામાં આવે છે ? - **રૂ.5 કરોડ**

523. માહિતી અધિકાર અધિનિયમ - 2005 અંતર્ગત માહિતી માંગનારને માહિતી કોમ્પ્યુટર ડિસ્ક કે ફ્લોપીમાં આપવાની હોય તો કેટલા રૂપિયા ફી લેવાની જોગવાઈ છે? - **50 રૂપિયા**

524. તમામ બાળકો માટે સંપૂર્ણ રોગ પ્રતિરક્ષા કવચ મજબુત બનાવવા ભારત સરકારનું અભિયાન જણાવો. - **ઈન્દ્રધનુષ**

525. સિનિયર સિટીઝનો માટે રેલ્વેમાં આરક્ષણ મેળવવા માટે ક્યારથી આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવેલ છે? - **તા.1-4-2017**

526. વરિષ્ઠ પેન્શન વીમા યોજના, 2017 અંતર્ગત જમા રકમ પર 8%ના દર આધારિત પેન્શન.....વર્ષો સુધી આપવામાં આવનાર છે. - **10**

527. માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, 2005 હેઠળ ''માહિતીનો અધિકાર'' એટલે, - **જાહેર સત્તા તંત્રના અંકુશ હેઠળ રહેલી માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર**

528. ભારત સરકારે દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રાપ્તિ એપનો ઉદેશ શું છે ? - **વીજળી ઉત્પાદન અને વીજળી વિસ્તરણ કરતી કંપનીઓ વચ્ચે પારદર્શિતા લાવવી.**

529. માનવ અધિકારીના ઉલ્લંઘનના આક્ષેપો સંબંધિ માહિતી કોની મંજૂરી મેળવીને પૂરી પાડવાની હોય છે ? - **કેન્દ્રીય માહિતી પંચ**

530. જાહેર ખાનગી ભાગીદારી પ્રકારે દત્તક લીધેલા પુરાતત્ત્વ પ્રોજેક્ટને મૂળભૂત સુવિધા પૂરી પાડવાનો મોન્યુમેન્ટ મિત્ર કાર્યક્રમ ક્યા મંત્રાલયે શરૂ કર્યો છે ? - **કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય**

531. ખેડૂતોના ઉત્પાદન ક્રેડિટને પહોંચી વળવા સમયસર અને પુરતું ધિરાણ આપવાનો હેતુ કઈ યોજનાનો છે ? - **કિસાન ક્રેડિટ કાર્ડ યોજના**

532. અપીલ સત્તાધીકારીના હુકમથી નારાજ થયેલ અરજદાર કેટલા દિવસમાં રાજ્ય માહિતી આયોગને બીજી અપીલ કરી શકશે ? - **90**

533. અરજદારે માંગેલ માહિતી જે તે જાહેર અધિકારીની હકુમત હેઠળ આવતી ન હોય તો એ અરજીને કેટલા દિવસમાં તબદીલ કરવી પડશે ? - **5**

534. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિનિયમ 2009 અંતર્ગત કેટલા ટકા ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવું ફરજીયાત છે ? - **25**

535. કઈ યોજના હેઠળ ભારતમાં 80,000 મિલિયન એકમ પ્રતિવર્ષ વીજ આવશ્યકતા વૃદ્ધિ થશે ? - **નીતિ આયોગની સૌભાગ્ય યોજના**

536. અરજદારે જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ હોય તો કેટલા દિવસમાં અપીલ સત્તાધિકારીને નમૂના 'જ'માં અપીલ કરી શકશે ? - **30**

537. રાજીવ ગાંધી સ્કીમ ફોર એમ્પાવરમેન્ટ ઓફ એડોલસન્સ ગર્લ્સ (સબળા) યોજના કોના માટે શરૂ કરવામાં આવી ? - **11થી 18 વર્ષની કિશોરીઓ માટે**

538. નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે? - **ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.**

539. શિક્ષણની ગુણવત્તા સુધારણા, શિક્ષણના પરિણામમાં વધારો અને કમ્પ્યૂટર દ્વારા શિક્ષણથી શિક્ષક-વિદ્યાર્થીનું સશક્તિકરણ કઈ યોજનાનો હેતુ છે ? - **સમગ્ર શિક્ષા યોજના**

540. 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? - **અનુસૂચિત જનજાતિ માટે**

541. મહિલા સ્વયં સ્વરોજગાર યોજના અંતર્ગત જેની વાર્ષિક આવક રૂ.35,000થી ઓછી હોય તેવી મહિલાઓને કમાણીનું નાનું કામ કરવા માટે રૂ........ની સહાય મળવાપાત્ર છે. - **2,500**

542. માન.રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગ્રામ કક્ષાની સગવડો સુધારવા ક્યો પ્રોજેક્ટ શરૂ કરેલ છે ? - **સ્માર્ટ સ્ટાન્ડર્ડ વિલેજ પાયલોટ (Smart Standard Village Pilot)**

543. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ક્યા રાહતદરે નમો ઈ-ટેબ પૂરા પાડ્યા છે ? - **રૂ.1,000**

544. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 4%ના વ્યાજદરથી રૂ.3 લાખ સુધી લોનની સગવડ ક્યા હેતુ માટે આપી શકાય તેવી યોજના બનાવેલ છે ? - **ખેતીકામ (Crop)**

545. 'દેખો અપના દેશ', 'પ્રવાસન અને શાસન', 'પ્રવાસન સર્વ માટે' ક્યા ઉત્સવનો હિસ્સો છે ? - **પર્યટન પર્વ**

546. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ બાળકોના શાળાપ્રવેશ સમયે ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ? - **કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ**

547. નીતિ આયોગની કઈ યોજના વૈશ્વિક આબોહવા પરિવર્તન પ્રતિબદ્ધતાને પહોંચી વળવા માટે કાર્યરત્ છે ? - **સૌભાગ્ય યોજના**

548. જંગલ વિસ્તાર નજીક હોય તો ગૌચર માટે સરકારી ધોરણ અનુસાર કેટલી જમીન હોવી જોઈએ ? - **100 ઢોર માટે 40 એકર**

549. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.31-12-2016ના રોજ કરવામાં આવેલ જાહેરાતો અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં કેટલા રૂપિયા સુધીની હોમ લોન ઉપર વ્યાજ દરમાં 3% નો ઘટાડો કરવામાં આવેલ છે ? - **રૂ.2.00 લાખ**

550. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના સાધનો / ઓજારો આપવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ? - **આઈ.એન.ડી. 31 માનવ કલ્યાણ યોજના**

551. ગુજરાત સરકાર દ્વારા વિજળી ઉત્પાદન અને વિતરણ, ક્લીન એન્ડ ગ્રીન ટેકનોલોજીના પ્રોજેક્ટ્સ વિગેરે માટે ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લી.દ્વારા પ્રોજેક્ટ્સને ફંડ પૂરુ પાડવા માટે કઈ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવે છે ? - **ગોલ્ડન ગુજરાત ગ્રોથ ફંડ (ગુજરાત 3 જી ફંડ) યોજના**

552. સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ બોર્ડ જેવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કઈ યોજનાનો હેતુ છે ? - **સમગ્ર શિક્ષા યોજના**

553. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલા ઝડપી નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારની વર્ગ-3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં પ્રતીક્ષા યાદીનું કદ કેટલું કરવામાં આવ્યું ? - **20%**

554. તાજેતરમાં કઈ આઈ.આઈ.ટી.એ પ્લાસ્ટિક વેસ્ટમાંથી ડીઝલ/ ફર્નેસ બનાવતી ટેકનોલોજી વિકસાવી છે ? - **આઈ.આઈ.ટી. મદ્રાસ**

555. રાજ્યમાં ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા અને અનાથને વિનામૂલ્યે માસિક ઘઉંનું વિતરણ કરવા કઈ યોજના અમલમાં મૂકેલ છે ? - **અન્નબ્રહ્મ**

556. નીતિ આયોગની કઈ યોજના શિક્ષણ, આરોગ્યને સુધારવામાં મદદ કરવી અને આર્થિક પ્રવૃત્તિ તેમજ રોજગારની તકો સાથે જોડાણમાં ગુણકાંક વધારામાં મદદરૂપ થવું છે. - **સૌભાગ્ય યોજના**

557. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા પરિક્ષિતલાલ મજમુદારના નામ સાથે જોડાયેલ યોજનામાં ક્યા વિદ્યાર્થીઓ લાભાન્વિત થાય છે ? - **એસ.એસ.સી. પૂર્વના વિદ્યાર્થીઓ**

558. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી ક્યા અધિનિયમથી અસ્તિત્વમાં આવી ? - **ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી અધિનિયમ-2007**

559. ઉચ્ચ પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક સુધીની છોકરીઓને સ્વબચાવની તાલીમ કઈ યોજનાનો હેતુ છે ? - **સમગ્ર શિક્ષા યોજના**

560. ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડિસેબિલિટી બિલ) ક્યારે મંજૂર કરવામાં આવ્યું ? - **2016**

561. ગુજરાત સરકાર દ્વારા મુની મેતરાજ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા માતા-પિતાના બાળકોને પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિની યોજના અંતર્ગત ક્યા વર્ષ પછી જન્મેલા ત્રીજા બાળકને લાભ મળવાપાત્ર નથી ? - **1995**

562. નમો ઈ-ટેબ ગુજરાત સરકારની કઈ યોજનાનો ભાગ છે ? - **મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના**

563. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને એસ.એસ.સી. પછીની તબીબી, ઈજનેરી વગેરે ડિગ્રી અને ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો માટે જૂથ એથી ઈ માટે વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? - **રૂ.900થી રૂ.4,250**

564. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન મેળવવા ક્યું માપદંડ સાચું છે ? - **સ્નાતક કક્ષાએ 50% મેળવ્યા બાદ અનુસ્નાતકના અભ્યાસક્રમ માટે**

565. ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં ? - **18 વર્ષ**

566. ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી કરવા માટેની યોજનામાં 75% કે તેથી વધુ શારીરિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિના સાથીદારને મુસાફરી ખર્ચમાં કેટલી રાહત આપવામાં આવે છે ? - **50%**

567. ગુજરાત સરકાર દ્વારા સુબેદાર રામજી આંબેડકર છાત્રાલય અનુદાન યોજના અંતર્ગત છાત્રાલયને ગૃહપતિના પગારની કેટલી સહાય આપવામાં આવે છે ? - **રૂ.4,500થી 5,500**

568. શહીદ થયેલ સૈનિકોના બાળકોને મદદ કરવા માટે સહાયરૂપ થવા ક્યું પોર્ટલ શરૂ કરાયું છે ? - **ભારત કા વીર પોર્ટલ**

569. તાજેતરમાં ગુજરાત સરકારે 7મા પગારપંચ મુદ્દે વિસંગતતાઓ વિશે મંત્રીમંડળની પેટા સમિતિની રચના કરી છે તેના અધ્યક્ષ કોણ છે ? - **નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી**

570. વિકલાંગ વ્યક્તિઓને સમાન તક, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી માટેનો અધિનિયમ ક્યા વર્ષમાં ઘડવામાં આવ્યો ? - **1995**

571. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'પોષણ સપ્તાહ'ની ઉજવણી ક્યા સપ્તાહ દરમિયાન કરવામાં આવે છે ? - **સપ્ટેમ્બર માસનું પહેલું સપ્તાહ**

572. પછાત વર્ગના છોકરાઓ માટેના છાત્રાલયોના મકાન બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા કેટલું સહાયક અનુદાન આપવામાં આવે છે ? - **એસ.ઓ.આર. મુજબ થતા કુલ ખર્ચના 75% અથવા રૂ.4 લાખ બેમાંથી જે રકમ ઓછી હોય તે**

573. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.1-5-2018ના રોજ 'સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન'નો ભરૂચ ખાતે ક્યા તળાવથી શુભારંભ કરવામાં આવ્યો ? - **કોસમડી**

574. વિકલાંગ વ્યક્તિઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ યોજના અન્વયે સહાય મેળવવા દૃષ્ટિ વિષયક વિદ્યાર્થીની ટકાવારી કેટલી હોવી જરૂરી છે ? - **80%**

575. નીતિ આયોગે પેટ્રોલ અને ડિઝલની જગ્યાએ વૈકલ્પિક ઈંધણ તરીકે ....નો ઉપયોગ વધારવા માર્ગદર્શિકા બનાવવાની દરખાસ્ત કરી છે. - **મિથેનોલ**

576. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી મધ્ય પ્રદેશના ક્યા જિલ્લામાં આવેલ છે ? - **અનુપપુર**

577. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? - **દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ**

578. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંગેની દેખરેખ ક્યું મંત્રાલય કરે છે ? - **નાણાં મંત્રાલય**

579. સરકારી યોજના અંતર્ગત 3,000થી વધુ પ્રતિભાશાળી આદિજાતિના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ખાનગી શાળાઓમાં અભ્યાસ મેળવી રહ્યા છે જેઓનો આર્થિક ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. - **ટેલેન્ટ પુલ વાઉચર યોજના**

580. જી.એસ.ટી. (GST)ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા ક્યું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ? - **GST સહેલી**

581. ભારત સરકારે રાષ્ટ્રીય સંપદાના પ્રતિક ચિહ્ન (મેસ્કોટ)..........નો શુભારંભ કર્યો. - **IP નાની**

582. સરકારશ્રીની ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત વિદ્યાર્થીદીઠ કેટલી સહાય આપવામાં આવે છે ? - **રૂ.40,000**

583. ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદ્દેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક્ટ' ક્યા વર્ષે પસાર કરવામાં આવ્યો ? - **1992**

584. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીનાં આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં ક્યા બોર્ડની રચના કરવામાં આવી છે ? - **ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ**

585. ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓને મળતી શિષ્યવૃત્તિ યોજના અન્વયે સહાય મેળવવા મુકબધિર વિદ્યાર્થીની સાંભળવાની ક્ષમતા કેટલી હોવી જરૂરી છે ? - **71 ડેસીબલ કે તેથી વધુ**

586. ભારતે ક્યા દેશ સાથે દિલ્હીમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સૌરસંધિ શિખર સંમેલનનું આયોજન કર્યું ? - **ફ્રાન્સ**

587. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર) નિવારણ (સુધારા નિયમો) 2016ની જોગવાઈ મુજબ ભારતના ફોજદારી અધિનિયમ, 1860ની કલમ-365 હેઠળ બળાત્કારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની વ્યક્તિને તબીબી પરીક્ષણ અને તબીબી રિપોર્ટને સમર્થનના તબક્કે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે ? - **રૂ.2,50,000**

588. હેલ્થ વિભાગને લગતી પ્રયોગશાળાની ગુણવત્તાના માપને પ્રમાણિત કરવા 'NABL' પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ બોર્ડનું પૂરું નામ જણાવો. - **નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ**

589. અનુસૂચિત જાતિના લોકોના લાભાર્થે મુકાયેલ માનવ ગરિમા યોજના ક્યા વર્ષથી અમલમાં મુકાયેલ છે ? - **2012**

590. સરકાર દ્વારા વાલ્મિકી, હાડી, તીરગર, થોરી, માતંગ વગેરે જેવી અતિ પછાત જાતિઓને ગૃહનિર્માણ માટે ગ્રામ્ય વિસ્તારમાં કેટલી સહાય આપવામાં આવે છે ? - **રૂ.70,000**

591. ગુજરાત સરકાર દ્વારા અપાતી સહાય અન્વયે વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? - **રૂ.47,200**

592. અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને આપવામાં આવતી (ડૉ.પી.જી. સોલંકી લોન સહાય)નું ધોરણ જણાવો. - **રૂ.7,000- 4%ના વ્યાજદરે**

593. સિકલ સેલ એનિમિયાગ્રસ્ત આદિવાસી લોકો માટે દર મહિને એક વ્યક્તિ દીઠ કેટલી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે ? - **રૂ.500**

594. ક્યા કાર્યક્રમની શરૂઆત વિદેશ મંત્રાલયે પાયાના સ્તરે હૈદરાબાદમાં, તેલંગાણાના લોકોના જાહેર નીતિના ઉદ્દેશને વધારવા માટે કરી છે. - **વિદેશ આયા પ્રદેશ કે દ્વાર**

595. ભારતની આઝાદી પહેલા બ્રિટિશ સરકારે ધર્મ અથવા જાતિના રૂપાંતરિત વ્યક્તિઓના અધિકારોને અસર કરતા બધા કાયદા નાબૂદ કર્યા હતા. આ ધારાનું નામ જણાવો. - **જાતિ અપંગતા નિવારણ ધારો, 1850**

596. કાળા બજાર, ભેળસેળ અને સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓને અટકાવવા રાજ્ય સરકારે 'કાળા બજાર નિવારણ અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ' ક્યા વર્ષથી અમલમાં મૂકેલ છે ? - **1980**

597. ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી બિલ)માં કેટલા પ્રકારની વિકલાંતાઓને શીડ્યુલમાં સમાવવામાં આવેલ છે ? - **21**

598. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગની કઈ કંપની દ્વારા તાજેતરમાં GST સહેલી વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ? **- ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ**

599. મ્યુનિસિપલ ઘન કચરો (વ્યવસ્થાપન અને સંચાલન- Management & Handling) નિયમન ક્યા વર્ષથી અમલી બન્યો ? **- 2000**

600. સ્વચ્છતા (Sanitation) શબ્દ ક્યા લેટિન શબ્દ પરથી આવ્યો છે? **- Sanus**

601. ESICનું પૂરું નામ જણાવો. **- Employees State Insurance Corporation**

602. જિલ્લા અને તાલુકાને જોડી વહીવટ તંત્રને વધુ અસરકારક બનાવવા સરકાર દ્વારા કઈ IP આધારિત પ્રત્યાયન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ? **- GSWAN**

603. ગુજરાતમાં જાહેર-ખાનગી ભાગીદારી ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? **- ગુજરાત માળખાગત વિકાસ ધારો-1999**

604. ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ નિર્મુલન કરવાની ઘોષણા ક્યારે કરવામાં આવી ? **- 1980**

605. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મેલેરિયા કન્ટ્રોલ પ્રોગ્રામ (NMCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો ? **- 1953**

606. સ્વાસ્થ્ય યોજના, રાષ્ટ્રીય સામાજિક આર્થિક યોજનાનો અનિવાર્ય હિસ્સો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજના વિશે 1946માં સૌપ્રથમ અહેવાલ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો ? **- ભોરે**

607. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ શેના માટે છે ? **- ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે**

608. પી.એફ.એ. (પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ) ક્યારે ઘડવામાં આવ્યો ? **- 1954**

609. ગુજરાત સરકારની કઈ પહેલનો હેતુ શિક્ષકો, વહિવટકર્તાઓ, ગ્રંથપાલોને ઉચ્ચ શિક્ષણના પડકારોને પહોંચી વળવા અને તેમની સર્વોચ્ચ ક્ષમતાઓને આકાર આપવાના પ્રશિક્ષણનો છે ? **- કર્મયોગી તાલીમ પહેલ**

610. જે લોકો ખુલ્લામાં મળવિસર્જન (શૌચક્રિયા) કરતા હોય તે સ્થળ ઘરથી ઓછામાં ઓછા કેટલા મીટરના અંતરે હોવું જોઈએ ? **- 20 મીટર**

611. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે 14 આદિવાસી જિલ્લાઓમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓને કઈ યોજના અંતર્ગત અનાજ પૂરું પાડવાનો ઠરાવ કરવામાં આવેલ છે ? **- અન્ન ત્રિવેણી યોજના**

612. જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ? **- કન્સેશન એગ્રીમેન્ટ**

613. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાના હેતુસર ગર્ભના જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ધ પીસી એન્ડ પીએનડીટી એક્ટ ક્યા વર્ષથી અમલમાં મૂકાયો છે ? **- વર્ષ 1994**

614. ભારત સરકારની કઈ યોજનાનો હેતુ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની વૈશ્વિક પ્રતિષ્ઠા અને ક્રમાંક સુધારવાની છે ? **- સ્ટડી ઈન ઈન્ડિયા**

615. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સંસ્થાનું નામ જણાવો. **- આઈ-ક્રિએટ**

616. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પ્રત્યેક ઉપભોક્તાએ કેટલા રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહે છે ? **- રૂ.330**

617. શાળા બહારની અને કદીએ શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટેની નિવાસી શાળા વ્યવસ્થાને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? **- કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય**

618. નીતિ આયોગના સ્ત્રીઓ દ્વારા ભારત પરિવર્તન પુરસ્કાર-2018ના કેન્દ્રમાં .... છે. **- સ્ત્રીઓ અને**

619. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી ? **- 2014**

620. ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ? **- 50%**

621. આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તે હેતુસર ધોરણ 6થી 12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવાની યોજનાનું નામ જણાવો. **- એકલવ્ય મોડેલ રેસિડન્સીયલ શાળા યોજના**

622. ભારત સરકારે તમામ પ્રવાસી ગાડીમાં (પેસેન્જર ટ્રેનમાં) જૈવિક-શૌચાલય બનાવવાની યોજના.......સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે. **- માર્ચ 2019**

623. 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સમર્પિત સ્થળ જ્યાં વિદ્યાર્થીઓ નવિનીકરણ અને કુશળતા શિખશે અને તેના વિચાર વિકાસથી ભારતમાં પરિવર્તન આવશે **- અટલ ટિન્કરિંગ લેબ**

624. ભારત સરકારે 125 મિલિયન યુ.એસ. ડોલરનો વિશ્વ બેંક સાથે STRIVE પરિયોજના હેઠળ કરાર કર્યો છે. આ પરિયોજના .... સાથે સંબંધિત છે. **- કૌશલ્ય વિકાસ**

625. હાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સરકારે 15 દિવસનો ઘરે-ઘરે જઈ ....રોગ નાબૂદી અભિયાન ઝુંબેશ શરૂ કરી છે. **- ક્ષય રોગ**

626. ગુજરાતની કઈ જનજાતિઓને આદિમ જાતિઓ તરીકે જાહેર કરેલી છે ? **- કાઠોડી, કોટવાલિયા, પઢાર, સીદી, કોલઘા**

627. ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2018-19 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર શહેરોમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેરોના નામ જણાવો. **- રાજકોટ, વડોદરા, સુરત, મહેસાણા**

628. ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2018-19 અંતર્ગત મુખ્યમંત્રી અમૃતમ (મા) અને મા-વાત્સલ્ય યોજના અન્વયે કીડની, લીવર અને પેન્ક્રીયાઝના પ્રત્યારોપણ માટે કેટલા રૂપિયા સુધીની સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે ? - **રૂ.5 લાખ**

629. જાતીય સતામણીને રોકવા ભારત સરકારે બનાવેલ 'પોક્સો' એક્ટનું પૂરુ નામ જણાવો. - **The Protection of Children from Sexual Offences Act**

630. બેટી બચાવો, બેટી પઢાવો યોજનાનો વિસ્તાર 161 જિલ્લાથી કેટલા દેશ વ્યાપી જિલ્લા સુધી કરાયો છે ? - **640 જિલ્લા**

631. ગુજરાત સરકાર દ્વારા ક્યા અભિયાન અંતર્ગત ખેડૂતોના હયાત એગ્રીકલ્ચર પંપને સોલાર પંપમાં ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે ? - **કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન**

632. MNREGAનું આખું નામ જણાવો. - **Mahatma Gandhi National Rural Employment Guraatee Act**

633. બાળમજૂરી (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ ક્યા વર્ષમાં બન્યો ? - **2016**

634. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના ક્યા વર્ષે થઈ ? - **1953**

635. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? - **દુર્ગાબાઈ દેશમુખ**

636. દહેજ પ્રતિબંધક કાનૂનનું વર્ષ ક્યું ? - **1961**

637. અન્ય પછાત વર્ગની બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? - **સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ**

638. RTI એટલે શું ? - **Right to Information**

639. છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ગુનો ના બનેલ હોય તેવું ગામ ......કહેવાય. - **પાવન ગામ**

340. PNDT એક્ટ કોની સાથે સંબંધિત છે ? - **ભ્રૂણ હત્યા**

641. ATVT એટલે શું ? - **આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો**

642. IGNDPSનું પૂરું નામ જણાવો. - **ઈન્દિરા ગાંધી નેશનલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ**

643. તેજસ્વીની પ્રોજેક્ટ કઈ સંસ્થા દ્વારા પુરસ્કૃત છે ? - **વર્લ્ડ બેંક**

644. 'અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - **માંડલ કમિશન**

645. સમાજના નબળા વર્ગોને પૂરી પાડવમાં આવતી સેવાઓને....... કહેવામાં આવે છે. - **સામાજ કલ્યાણ સેવાઓ**

646. સ્વ મદદ જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રૂપ)નો મુખ્ય ઉદેશ શું છે ? - **સશક્તિકરણ**

647. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે સેન્દ્રિય ખેતી ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને ઉત્તેજન આપવા કેવી યુનિવર્સિટી સ્થાપવાનું આયોજન કરવામાં આવેલ ? - **ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી**

648. સ્વરોજગારી માટે ગ્રામીણ યુવકોને તાલીમનો સમાવેશ કઈ યોજનામાં થતો હતો ? - **સંકલિત ગ્રામ વિકાસ યોજના**

649. પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં કેટલા વર્ષથી વધુ વયની વ્યક્તિઓ રોકાણ કરી શકે છે ? - **60 વર્ષથી વધુ વયની**

650. બૃહદ આર્થિક મહત્ત્વના મુદ્દાઓ પર પ્રધાનમંત્રીને સલાહ આપવા માટે રચવામાં આવેલ પ્રધાનમંત્રીની આર્થિક સલાહ પરિષદના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થયેલ છે ? - **ડૉ.વિવેક દેબરોય**

651. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'સ્પર્શ' યોજના શાને સંબંધિત છે ? - **ટપાલ ટિકિટ સંગ્રહ**

652. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 32 સ્વયં પ્રભા ડી.ટી.એચ. ચેનલ કોને લગતી છે ? - **શિક્ષણ**

653. કઈ યોજના અંતર્ગત વનોની નજીક રહેતા લોકોને ગૌણવન્ય પેદાશોની માલિકીનો અધિકાર પ્રાપ્ત થયો છે ? - **સંયુક્ત વન વ્યવસ્થાપન**

654. પરમવીર ચક્ર મેળવેલ સૈનિકોની વિદ્યાર્થીઓને ફોટાના માધ્યમથી જાણકારી આપવા ક્યું અભિયાન શરૂ કરાયેલ છે ? - **વિદ્યા વિરતા અભિયાન**

655. સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી ? - **સાતમી**

656. કેવીકે (KVK)નું પૂરું નામ જણાવો. - **કૃષિ વિજ્ઞાન કેન્દ્ર**

657. અટલ પેન્શન યોજના અંતર્ગત જે તે ઉપભોક્તા 60 વર્ષની વય બાદ કેટલી મર્યાદમાં માસિક પેન્શન મેળવી શકે છે ? - **રૂ.1000થી 52,00**

658. ભારત સરકારની 'ભીમ'(BHIM) આધાર પે એપ યોજના તા.14 એપ્રિલ-2017ના રોજ ક્યાથી શરૂ કરવામાં આવી ? - **નાગપુર-મહારાષ્ટ્રથી**

659. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ.....- **1લી મે, 2016**

660. સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાથી કરાવ્યો હતો ? - **ભુજોડી-કચ્છ**

661. ભારત સરકારનું ગર્વ પોર્ટલ ક્યા કાર્યક્રમ સાથે સંકળાયેલું છે ? - **ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં વીજળી જોડાણ આપવાની યોજના**

662. એસ.ટી. નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે ? - **સ્ત્રીઓ માટે**

663. એસ.ટી. નિગમની બસોમાં શાળા/મહાશાળામાં ભણતા વિદ્યાર્થીઓને નિયત બસભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે ? - **82.5%**

664. ક્યા બે મંત્રાલયોએ નાના કાપડ ઉદ્યોગોને મદદ કરવા માટે 'સાથી' (SATHI) શરૂ કર્યું ? - **કાપડ મંત્રાલય-ઊર્જા મંત્રાલય**

665. ટ્વિટર પર 'આસ્ક ધ સ્પોકસપર્સન' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી ? - **વિદેશ મંત્રાલય**

666. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો અમલ કોના દ્વારા કરવામાં આવે છે ? - **નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન**

667. આદિજાતિના બાળકોને શિક્ષણમાં સહાય આપતી 'એકલવ્ય મોડેલ રેસિડેન્સી યોજના' અન્વયે કેટલું આવકનું ધોરણ નક્કી કરવામાં આવેલ છે ? - **કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી**

668. 'જળ સંચય' અને 'જળ સિંચન' દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો માટેની કેન્દ્ર સરકારની યોજના જણાવો. - **પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના**

669. બાળકોની જાતીય સતામણી કેસમાં ઝડપી ન્યાય મળે તે માટે ભારતની કેન્દ્ર સરકારે ક્યો કાયદો અમલી બનાવ્યો છે ? - **ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-2012**

670. ભારતમાં રેઈનબો ક્રાંતિ (રેઈનબો રિવોલ્યુશન) શેની સાથે સંકળાયેલી છે ? - **કૃષિના વિવિધ ક્ષેત્રોનો વિકાસ**

671. જૈવિક વિશ્લેષણ માટે બાયોટેકનોલોજી વિભાગે કઈ નદી ઉપર 'લેબ ઓન બોટ' પ્રયોજના જાહેર કરી છે ? - **બ્રહ્મપુત્રા**

672. ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? - **ધીરૂભાઈ શાહ**

673. સુકન્યા સમૃદ્ધિ ખાતામાં વર્ષમાં લઘુત્તમ રકમ કેટલી જમા કરવાની હોય છે અને મહત્તમ રકમ કેટલી જમા કરાવી શકાય છે ? - **રૂ.1,000 અને રૂ.1,50,000**

674. 'પ્રધાનમંત્રી જનધન યોજના' અંતર્ગત ઉદ્ઘાટનના દિવસે કેટલા બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા ? - **લગભગ દોઢ કરોડ**

675. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કઈ ઉંમર મર્યાદા ધરાવતા લોકો જોડાઈ શકે છે ? - **18થી 70 વર્ષ**

676. ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓને લગતી સમગ્ર ભારતમાં પ્રથમ એવી કઈ પોલિસી જાહેર કરી ? - **સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી**

677. માહિતી અધિકાર અધિનિયમ-2005 અંતર્ગત એક BPL અરજદાર માહિતી મેળવવા ઈચ્છે છે. તેણે, કેટલા રૂપિયા 'અરજી ફી'ના ભરવા પડે ? - **કોઈપણ ફી ભરવી પડે નહીં**

678. માહિતી અધિકાર અધિનિયમ-2005ની જોગવાઈ મુજબ Recordની વ્યાખ્યામાં શેનો સમાવેશ થાય છે ? - **કોઈપણ દસ્તાવેજ, હસ્તપ્રત, ફાઈલ, માઈક્રોફિલ્મ, ફેસીમાઈલ કોપી, ફાઈલ નોટિંગ**

679. ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન) યોજનામાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું જોડાણ થશે ? - **22 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો**

680. ગુજરાત રાજ્યના માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત બનેલા નિયમો મુજબ A-4 અથવા A-3 સાઈઝના એક પાનાની માહિતી માટે (BPL સિવાય) કેટલા રૂપિયા ફી નિયત થઈ ? - **રૂપિયા બે**

681. GDCR શું છે ? - **બાંધકામ અંગેના નિયમો**

682. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત ક્યા વર્ષમાં થઈ હતી ? - **2006-07**

683. ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મીશનની શરૂઆત ક્યા વર્ષથી કરવામાં આવી ? - **2014**

684. બૃહદ સિંચાઈ યોજનામાં કૃષિ યોગ્ય કમાંડ ક્ષેત્ર કેટલા હેક્ટર હોય છે ? - **10,000 હેક્ટરથી વધુ**

685. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનનો ઉદ્દેશ પંચાયતી રાજની સંસ્થાઓમાં ....ના વિકાસ માટે સહાયક રૂપ થવુ. - **ટકાઉ વિકાસ, લક્ષ્યો સુધી પહોંચાડવા માટે શાસનની ક્ષમતાઓ**

686. કઈ બેંક દ્વારા દેશમાં સૌપ્રથમ આધાર કાર્ડ આધારિત એટીએમ કાર્ડ શરૂ કરવામાં આવેલ છે ? - **ડીસીબી બેંક**

687. કેન્દ્રીય વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ભારતીય સર્વેક્ષણની કેટલામી જયંતિના અવસર પર એક નવા વેબ પોર્ટલ નકશેની શરૂઆત કરેલ છે ? - **250 મી**

688. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં બાગ બગીચાઓ, વનરાજીઓના વિકાસ થાય તે માટેની ગુજરાત રાજ્યની યોજનાનું નામ શું છે ? - **પંચવટી યોજના**

689. 'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝૂંબેશ ચલાવે છે ? : **વધુ વૃક્ષો વાવો**

690. 'RUDI' (રૂડી)ની સ્થાપના ક્યા વર્ષમાં સેવા ગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી ? : **2004**

691. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે - **રૂ.330**

692. ડિજિટલ ગુજરાત હેઠળ કઈ ઓનલાઈન સેવાઓ મળે છે ? - **નવા રેશનકાર્ડની અરજી, ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર, ચારિત્ર્યનું પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, ખેડૂત પ્રમાણપત્ર**

693. 2003માં ગુજરાતમાં રોકાણની ગતિવિધિ વધારવા શેની શરૂઆત કરવામાં આવી ? - **વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ**

694. સાંસદ સભ્યો માટેની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાની શરૂઆત ક્યારે થયેલ ? - **23 ડિસેમ્બર, 1993**

695. ગુજરાતના તમામ ગ્રામીણ વિસ્તારોમાં...........માટે 24 કલાક વીજળી આપવામાં આવે છે ? - **સિંગલ ફેઝ અને થ્રી ફેઝ**

696. ક્યા રાજ્યએ ગંગા હરિતિમા યોજના શરૂ કરી છે ? - **ઉત્તર પ્રદેશ**

697. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદો ક્યારથી અમલમાં આવેલો છે ? - **2006**

698. ભારત વિશે જાણો કાર્યક્રમ હેઠળ મહત્તમ કેટલા ડાયસ્પોરા યુવાનોનું ચયન થશે ? - **40**

699. કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે કેટલી રકમની રોકડ સહાય આપવામાં આવે છે ? - **રૂા. 6000**

700. અનુસૂચિત જનજાતિને માટે જમીન સંપાદનનો કાયદો ક્યારે પસાર કર્યો ? - **2006**

701. માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ, 2005 હેઠળ જો માંગવામાં આવેલ માહિતી અન્ય જાહેર સત્તામંડળ' સાથે સંકળાયેલ હોય તો, જાહેર માહિતી અધિકારીએ તે સત્તામંડળને કેટલા દિવસમાં તે બાબત તબદીલ કરવી જોઈએ? - **5**

સંસ્થા

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

1. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક)માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ?
A) ભારત B) નેપાળ C) પાકિસ્તાન D) ચીન

GPSC પેપર - 1 - 2017

2. નોંધાયેલ સ્વૈચ્છિક મંડળ, "ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ"નું વડું મથક ક્યું છે ?
A) પેરીસ, ફ્રાન્સ B) બર્લિન, જર્મની
C) જીનેવા, સ્વિટ્ઝર્લેન્ડ D) હેલસિન્કી, ફિનલેન્ડ
3. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?
A) વિશ્વ બેંક B) ટ્રસ્ટીશીપ કાઉન્સીલ
C) સીક્યુરીટી કાઉન્સીલ D) સામાન્ય સભા
4. નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે ?
A) ભારત - યુ.એસ. પરમાણુ સંધિ
B) ભારત - શ્રીલંકા સંધિ C) ભારત - નેપાળ વેપાર સંધિ
D) ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધી
5. કયા દેશ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના અધિકારક્ષેત્ર હેઠળ નથી ?
A) યુ.એસ.એ., રશિયા, ચીન, ઈઝરાયેલ
B) યુ.એસ.એ., યુ.કે., રશિયા, ફ્રાન્સ
C) યુ.કે., ફ્રાન્સ, ચીન, પાકિસ્તાન
D) ફ્રાન્સ, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન

GPSC પેપર - 2 - 2017

6. સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ (UNDP) લિંગ વિકાસ સૂચાંક નીચેના પૈકી કયા ત્રણ પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરૂષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ-અસંગતતા માપે છે ?
A) આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો
B) ગરીબી, બેરોજગારી અને આરોગ્ય
C) અસમાનતા, આવક અને ખર્ચ
D) આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા
7. નીચેના પૈકી કયો દેશ BIMSTEC નો સભ્ય નથી ?
A) થાઈલેન્ડ B) મલેશિયા C) શ્રીલંકા D) ભૂતાન

GPSC MAINS પેપર - 1 - 2016

8. WTOનો કરાર ક્યારથી અમલમાં આવ્યો ?
A) જાન્યુઆરી 1, 1994 B) જાન્યુઆરી 1, 1995
C) જાન્યુઆરી 1, 1996 D) જાન્યુઆરી 1, 1998
9. WTO હેઠળ કાપડ અને વસ્ત્ર ઉદ્યોગના વેપાર અંગેના કરારો કે જેમાં બિન જકાત અવરોધો નાબૂદ થશે તેનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
A) જાન્યુઆરી 1, 1996 B) જાન્યુઆરી 1, 1998
C) જાન્યુઆરી 1, 2005 D) જાન્યુઆરી 1, 2010
10. નીચેના પૈકી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે?
A) વિશ્વ બેંક (World Bank)
B) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)
C) સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO)
D) સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પ્રોગ્રામ (UNDP)
11. SAARCનો મુખ્ય હેતુ શું છે ?
A) બિન સમરેખી (Non Alignity)
B) પ્રાદેશિક સહકાર
C) બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી
D) ઉપરના પૈકી એકપણ નહી
12. ASEANનુ સચિવાલય ક્યાં આવેલું છે ?
A) સિંગાપુર B) મલેશિયા C) ઈન્ડોનેશિયા D) થાઈલેન્ડ

GPSC MAINS પેપર - 2 - 2016

13. જૈવિક અને ઝેરી હથિયારોના વિકાસ અને કબજા ઉપર પ્રતિબંધ મૂકતુ સંયુક્ત રાષ્ટ્ર કનવેન્શન ક્યું હતું ?
A) સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ ઠરાવ 1540 (2004)
B) જૈવિક હથિયાર કનવેન્શન (1972)
C) પેરીસ કનવેન્શન (1980)
D) જીનીવા કનવેન્શન (1980)

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

14. 1967માં પાંચ દેશો દ્વારા બેંગકોક ડેકલેરેશન પછી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના થઈ ?
A) નાફ્ટા (NAFTA) B) એસીયન (ASEAN)
C) સાર્ક (SAARC) D) સાપટા (SAPTA)

1)D, 2)B, 3)D, 4)D, 5)A, 6)A, 7)B, 8)B, 9)C, 10)D, 11)B, 12)C, 13)B, 14)B.

15. ....નું 12મું સેશન એક્રા, ઘાનામાં 20 થી 25 એપ્રીલ, 2008 યોજાયો.
A) સાર્ક (SAARC) B) સાપ્ટા (SAPTA)
C) અંકટાડ (UNCTAD) D) નાફ્ટા (NAFTA)

16. 1991માં છઠ્ઠું સાર્ક સમિટ ક્યા શહેરમાં યોજાયું ?
A) કોલમ્બો B) દિલ્હી C) ઢાકા D) કરાંચી

17. 1 જાન્યુઆરી, 1995થી GATT............માં પરિવર્તીત થયેલ.
A) WTO B) IMF C) IBRD D) UNCTAD

18. કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે ?
A) IMF અને WTO B) IMF અને IBRD
C) SAPTA અને NAFTA D) SAARC અને ASEAN

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

19. બ્રિક્સ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થયો છે?
A) ચીલી અને સાઉદી અરેબિયા B) ચીન અને શ્રીલંકા
C) ચીન અને સાઉથ આફ્રિકા D) ક્યુબા અને સ્પેન

20. સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ?
A) તાજિકિસ્તાન B) ચાઈના
C) ઉઝબેકિસ્તાન D) માલદીવ

GPSC પ્રિલિમ - 2001

21. CHOGM એટલે શું ?
A) કોમન હોલીડે ઓન ગવર્નમેન્ટ મની
B) કોમનવેલ્થ હેડઝ ઓફ ગવર્નમેન્ટ મિટિંગ
C) ચેરમેન ઓર જનરલ મેનેજર
D) આમાંનુ કશું નહીં

GPSC પ્રિલિમ - 2007

22. WHO શું છે ?
A) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
B) વર્લ્ડ હાઉસિંગ ઓર્ગેનાઈઝેશન
C) વર્લ્ડ હોમ ઓફિસ
D) વર્લ્ડ હાર્ટસર્જરી ઓર્ગેનાઈઝેશન

23. SAARC (સાર્ક) ક્યા દેશોનું સંગઠન છે ?
A) દક્ષિણ અમેરિકા B) દક્ષિણ આફ્રિકા
C) દક્ષિણ એશિયા D) ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ

24. વિશ્વ વ્યાપાર સંઘ (WTO)નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
A) ન્યૂયોર્ક B) લંડન C) જિનીવા D) પેરિસ

25. રાષ્ટ્રીય સંઘ (UNO)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
A) જિનીવા B) લંડન C) ન્યૂયોર્ક D) વોશિંગ્ટન

GPSC પ્રિલિમ - 2014

26. ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ (GEMS)ની શરૂઆત કોણે કરી હતી ?
A) સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, અમદાવાદ
B) ગંગા શુદ્ધિકરણ મંત્રાલય
C) યુનેપ (UNEP - United Nations Environment Programme)
D) ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટ, નવી દિલ્હી

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

27. WHO નું વડું મથક ક્યાં આવેલું છે?
A) ન્યૂયોર્ક B) પેરીસ C) હેગ D) જીનીવા

PSI/ASI GK - 2/5/2015

28. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું ?
A) ઓગસ્ટ 1944 B) એપ્રિલ 1945
C) ઓક્ટોબર 1945 D) ઓક્ટોબર 1944

29. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે ?
A) દર માસે B) એક વાર C) બે વાર D) પાંચ વાર

30. એફ.એ.ઓ. (FAO) (ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં છે ?
A) દિલ્હી B) જાકાર્તા C) લંડન D) રોમ

31. વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
A) 1946 B) 1945 C) 1947 D) 1952

32. નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?
A) નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ B) નોર્થ એશિયન મુવમેન્ટ
C) નોર્થ એલાઈડ મુવમેન્ટ D) આમાંથી એક પણ નહીં

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

33. હાલમાં UNO માં કેટલી ભાષાઓને ઓફીશીયલ લેંગ્વેજ (official language) તરીકે માન્યતા આપવામાં આવેલી છે?
A) 4 B) 5 C) 6 D) 7

15)C, 16)A, 17)A, 18)B, 19)C, 20)D, 21)B, 22)A, 23)C, 24)C, 25)C, 26)C, 27)D, 28)B, 29)B, 30)D, 31)B, 32)D, 33)C.

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

34. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી?
A) 1945 B) 1947 C) 1983 D) 1984

GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

35. આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતનું વડું મથક ક્યું છે?
A) ન્યૂયોર્ક B) વોશિંગ્ટન ડી.સી.
C) હેગ D) જીનીવા

GPSC Class - 2 - 12/2/2017

36. "Global Economic Report" કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે?
A) ધી વર્લ્ડ બેન્ક B) રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
C) (IMF) D) એશીયન ડેવલપમેન્ટ બેંક

GPSC Class-1 - 15/01/2017

37. યુનિસેફ સંસ્થા ખાસ કરીને નીચેના પૈકી કોના માટે કાર્યરત છે?
A) માતાઓ અને બાળકો માટે B) વૃદ્ધો માટે
C) ફક્ત કિશોરીઓ માટે D) દર્દીઓ માટે

38. નીચે દર્શાવેલ ચાર પૈકી કઈ ત્રણ સંસ્થાઓ/કાર્યક્રમની સહાય સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ) મેળવે છે?
1) UNICEF 2) CDC 3) CARE 4) WFP
A) 1, 3, 4 B) 1, 2, 3 C) 2, 3, 4 D) 1, 2, 4

39. રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા બાળ હક્કો માટે તૈયાર કરેલ જાહેરનામામાં જાહેર કરેલા હક્કોની સંખ્યા કેટલી છે?
A) 10 B) 11 C) 12 D) 13

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

40. 'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે?
A) પ્રાણી સંરક્ષણ B) પર્યાવરણ સંરક્ષણ
C) માનવ અધિકારોનું જતન D) ઐતિહાસિક માળખાઓની સુરક્ષા

GPSC Class - 2 - 18/03/2017

41. હાલમાં "IMF" બાબતે ઘણી ચર્ચા ચાલે છે. IMF નું નામ શું છે. આ બાબતે ઈકોનોમિક સર્વેમાં પણ ચર્ચા કરવામાં આવેલી છે.
A) ઈન્ટરનેશનલ મટીરિઅલ B) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ
C) ઈન્ડિયન મેન્યુફેક્ચરીંગ ફેડરેશન
D) ઈન્ડિયન મિલ્ક ફેડરેશન

GPSC Class - 2 - 16/04/2017

42. ક્યા દેશને સાઉથ એશીયા સબરીજીયોનલ ઈકોનોમીક કો-ઓપરેશન પ્રોગ્રામ (SASEC Programme) માં 7માં સભ્ય તરીકે દાખલ કરવામાં આવેલ છે?
A) બાંગ્લાદેશ B) નેપાળ C) મ્યાનમાર D) ભુતાન

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

43. નીચેના પૈકી કઈ કોન્ફરન્સ આઈ.એમ.એફ. (IMF)ની સ્થાપનામાં પરિણમી ?
A) હવાના કોન્ફરન્સ B) રોમ કોન્ફરન્સ
C) બ્રેટનવુડ કોન્ફરન્સ D) જીનીવા કોન્ફરન્સ

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

44. પ્રાથમિક શિક્ષણ બધાને પહોંચે તેવું કાર્ય નીચેનામાંથ કોણ કરે છે?
A) યુનોની મહાસભા B) ડબલ્યુ એચ.ઓ.
C) યુનેસ્કો D) યુનિસેફ

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

45. કઈ સંસ્થા આંતરરાષ્ટ્રિય વેપારને નિયંત્રિત કરે છે ?
A) U.N.O. B) F.A.O. C) W.T.O. D) I.M.F.

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

46. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)નું હેડ ક્વાર્ટર (મુખ્ય મથક) ક્યાં આવેલ છે ?
A) જીનીવા B) પેરીસ C) રોમ D) વીએના

વિસ્તરણ અધિકારી - 7/1/2017

47. આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ?
A) ન્યુ દિલ્લી B) લંડન C) ટોરન્ટો D) જીનીવા

48. આંતરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના ક્યારે થયેલી ?
A) 1857 B) 1895 C) 1904 D) 1912

49. વિશ્વબેંકનું 189 મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ?
A) ભારત B) નાઈજીરીયા C) નોરું D) સ્પેન

50. વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગનાઈઝેશન(WMO)એ નીચેનામાંથી શું છે ?
A) વિશ્વ આરોગ્ય સંસ્થા B) વિશ્વ વ્યાપાર સંસ્થાન
C) ત્રણ પૈકી એક પણ નહી. D) વિશ્વ હવામાન સંસ્થા

34)A, 35)C, 36)A, 37)A, 38)A, 39)A, 40)C, 41)B, 42)C, 43)C, 44)C, 45)C, 46)A, 47)D, 48)B, 49)C, 50)D.

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

51. વિશ્વ બેંકનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?

A) ન્યૂયોર્ક B) લંડન

C) વોશિંગ્ટન ડી.સી D) નેધરલેન્ડ

TET- II - ભાષા - 2014

52. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના વર્ષ 1948માં ક્યા સ્થળે થઈ હતી? - જીનીવા

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

53. વિશ્વશાંતિ અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સહકારનું પ્રતિક ક્યું છે ? - સંયુક્ત રાષ્ટ્રો

TET- II - સામાજિક વિજ્ઞાન - 2015

54. સંયુક્ત રાષ્ટ્રોના અંગો કેટલા છે ? - છ(6)

નાયબ મામલતદાર/DY.S.O - 2015

55. બ્રિક્સ (BRICS) બેંકનું વડુ મથક ક્યા નક્કી કરવામાં આવ્યું છે? - શાંઘાઈ

56. ભારતને પોલિયોમુક્ત દેશ..............એ જાહેર કર્યો છે. - વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

ઓફિસ આસિસ્ટન્ટ - 2015

57. 'SAARC' દેશોના સમૂહને શું કહેવામાં આવે છે ? - સાઉથ એશિયન એસોસીએશન ફોર રીજીઓનલ કો-ઓપરેશન

PSI - 2012

58. W.H.Oનું વડું મથક ક્યા આવેલું છે ? - જિનિવા

59. સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતી (Security Council) ના કાયમી સભ્ય દેશ કેટલા છે ? - 5

આયુર્વેદિક ડોક્ટર - 2000

60. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)નું વડુંમથક ક્યાં આવેલું છે? - જીનિવા

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

61. ઈન્ટરનેશનલ લેબર (મજદૂર) ઓર્ગેનાઈઝેશનનું વડુંમથક ક્યાં આવેલું છે ? : જીનિવા

62. ઓપેક (OPEC) કઈ બાબત સાથે સુસંગત છે ? : ખનિજ તેલ

63. IAEAનું પૂરું નામ આપો ? : ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી

64. NASAનું પૂરું નામ આપો. : નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન

65. ગ્રીન પીસ શું છે ? : પર્યાવરણીય સંસ્થા

66. યુએનની કઈ સંસ્થા બાળકોના આરોગ્ય અને વિકાસ માટે કાર્યરત્ છે ? : યુનિસેફ (યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ)

67. WHOનું વડુંમથક ક્યા આવેલું છે? : જીનિવા

68. યુનેસ્કોનું વડુંમથક ક્યા છે ? : પેરિસ

69. ITUનું પૂરું નામ આપો. : ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન

70. ઈન્ટરપોલનું વડુંમથક ક્યા આવેલું છે? : લ્યોન, ફ્રાન્સ

71. બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળકલ્યાણના કાર્યક્રમો નીચે પૈકી કઈ સંસ્થા કરે છે ? : UNICEF (યુનિસેફ)

72. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી છે ? - 15

73. ક્યો કરાર આંતરરાષ્ટ્રીય પરિવહન અને અભિવહન સંપથ સંદર્ભે પર્શિયન ગલ્ફ અને મધ્ય એશિયાના જોડાણને નોંધાપાત્ર રીતે વેપાર અને રોકાણમાં વેગ આપશે ? - અશ્ગાબાત સમજૂતી

74. ભારતીય મહાસાગર રીમ વિસ્તારમાં સામાજિક વિકાસ કરવાનો હેતુ કઈ સંસ્થાનો છે ? - IORA (ઈન્ડિયન ઓશન રીમ એસોસિએશન)

75. UNDPનું વડુંમથક ક્યાં આવેલું છે ? - ન્યૂયોર્ક

76. તમાકુ સંદર્ભે વિશ્વની પ્રથમ સહમતી કઈ છે ? - WHO-FCTC

77. ક્યા સંગઠનમાં ભારત સ્થાપક સભ્ય ન હતું ? - શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન

78. ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિયર વેપન્સ (ICAN)નું મુખ્ય મથક ક્યા આવેલું છે ? - જીનિવા

79. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કન્ટ્રોલ હેઠળ ખેડૂતોની જોગવાઈ જણાવો. - તમાકુ ઉત્પાદન કરતા ખેડૂતોને અન્ય પાક ઉગાડવા જરૂરી મદદ કરવી

51)C.

80. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)નું વડુમથક ક્યાં આવેલું છે? **- બર્ન (સ્વિત્ઝરલેન્ડ)**

81. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ક્યા પ્રકારના સહકારથી ચાલતી સંસ્થા છે ? **- ત્રિપક્ષીય સહકાર**

82. BRICS દેશોમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થાય છે ? **- ચીન અને સાઉથ આફ્રિકા**

83. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલતમાં સભ્યપદનું વિતરણ એશિયામાંથી કેટલા સભ્યોના પ્રતિનિધિત્વની પરવાનગી આપે છે ? **- 3**

84. ક્યા વર્ષે રચાયેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ભારત સંસ્થાપક સભ્યો પૈકીનો એક છે ? **- 1945**

85. ધી જનરલ એજ્યુકેશનલ ક્વોલિટી એનાલિસીસ ફ્રેમવર્ક (GEQAF) પદ્ધતિ કોના દ્વારા વિકસાવાયેલ છે ? **- યુનેસ્કો**

86. 1967માં પાંચ દેશો દ્વારા બેંગકોક ડેક્લેરેશન પછી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના થઈ ? **- આસિયાન**

87. UNEPનું વડુમથક ક્યા આવેલું છે ? **- નાયરોબી**

88. પર્યાવરણના જતન માટે કાર્યરત IUCNનું પૂરું નામ આપો. **- ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર**

89. ચાંચીયાગીરી સામે સુરક્ષા અને રક્ષણમાં વધારો કરવો તેમજ વેપારમાં સરળતા કરવી કઈ સંસ્થાનો હેતુ છે ? **- ઈન્ડિયન ઓશન રીમ એસોસિએશન (IORA)**

90. યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 21 હેઠળ વૈશ્વિક તાપમાન વધારો આ સદીમાં કેટલાં ટકાથી ઓછો રાખવાનો ધ્યેય છે? **- 2%**

91. 1લી જાન્યુઆરી, 1995થી GATT....... માં પરીવર્તિત થયેલ છે. **- WTO**

92. યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (UNIDO)નું વડુમથક ક્યા જોવા મળે ? **- વીએના**

93. યુનેસ્કોનું પૂરું નામ આપો. **- યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન**

94. ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિયર વેપન્સ (ICAN)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? **- 2007**

95. યુરોપીયન સંઘ (યુનિયન)નું વડુમથક ક્યાં આવેલું છે ? **- બ્રસેલ્સ**

96. ઈન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (IBRD)નું વડુમથક ક્યા છે ? **- વોશિંગ્ટન ડી.સી.**

97. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)નું વડુમથક ક્યા આવેલું છે? **- જીનિવા**

98. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલ છે ? **- રોમ**

99. યુનિસેફનું વડુમંથક જોવા મળે ? **- ન્યૂયોર્ક**

100. FAO (Food Agriculture Organization)નું હેડક્વાટર હાલ ક્યા આવેલું છે ? **- રોમ**

101. કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડસ ટ્વિન્સ તરીકે ઓળખાય છે ? **- IMF અને IBRD**

102. વિશ્વભરમાં વિકસતા દેશોના જરૂરિયાતમંદ બાળકો અને તેમની માતાઓને માનવતાસભર અભિગમ સાથે સ્વાસ્થ્ય તેમજ ખોરાકની સહાયતા પૂરી પાડતી સંસ્થા UNICEFનું મૂળભૂત નામ જણાવો. **- United Nations International children's EmergencyFund**

103. વર્લ્ડ ફાઈનેન્ક્સ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે જેમાં વ્યક્તિગત, બચત, ચુકવણી અને જોખમોનું સંચાલન જેવી બાબતો ધ્યાને લેવાય છે ? **- વર્લ્ડ બેંક**

104. યુનાઈટેડ નેશન્સનું ક્યું ઓર્ગેનાઈઝેશન સ્પેનના મેડ્રીડ ખાતે તેનું મુખ્ય મથક ધરાવે છે ? **- વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન**

105. સંયુક્ત રાષ્ટ્રોનું કાર્યાલય ક્યા આવેલું છે ? **- ન્યૂયોર્ક**

106. આઈ.એમ.એફ. (IMF)ના જીડીપી (GDP) ડેટા પ્રમાણે ક્યો દેશ વિશ્વનો સૌથી સમૃદ્ધ/ધનિક દેશ છે ? **- કતાર**

107. દક્ષિણ એશિયા મુક્ત વેપાર કરાર (SAFTA) સફળ ન થવાના કારણો જણાવો. **- દેશોનો ખૂબ જ મર્યાદિત નિકાસફલક અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ**

108. IBRDની સ્થાપના ....ના વર્ષમાં થઈ. **- 1945**

109. ભારત સૂચિત મુક્ત વેપાર કરારથી ASEAN અને અન્ય 5 દેશો સાથે જોડાવવા ઈચ્છે છે. આ સુચિત આર્થિક સોદાનું નામ......... છે. **- રીજીયોનલ કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ**

110. ક્યા દેશમાંથી સંયુક્ત રાષ્ટ્ર સૈનિકોએ તેમના 13 વર્ષીય લશ્કરી શાંતિ સ્થાપના મિશન પૂર્ણ કર્યા બાદ વિદાય લીધી ? **- હૈતી**

111. વિશ્વની મધ્યસ્થ બેંક તરીકે.......ઓળખાય છે. **- IMF**

112. ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિયર વેપન્સ (ICAN)ની સ્થાપના ક્યા સ્થળે થઈ હતી ? **- મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા**

113. પાકિસ્તાન દ્વારા ફાંસીની સજા પામેલા કુલભૂષણ જાદવને ફાંસી સામે મનાઈહુકમ આપવા ભારત દ્વારા કઈ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી ? **- ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ**

114. ક્યા બે દેશોએ ગલ્ફ એસોસિએશન કાઉન્સિલથી અલગ આર્થિક અને ભાગીદારી જૂથની રચના કરી છે ? **- યુએઈ અને સાઉદી અરેબિયા**

115. વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પડાય છે? **- UN Water**

પર્યાવરણ

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
A) 1970 B) 1974 C) 1980 D) 1985

રેવન્યૂ તલાટી - 28/02/2016

2. નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?
A) કાર્બન ડાયોક્સાઈડ
B) હાઈડ્રોફ્લોરો કાર્બન (HFC)
C) ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
D) આપેલ તમામ

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

3. નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?
A) નાઈટ્રોજન B) ઓક્સિજન
C) કાર્બન ડાયોક્સાઈડ D) ઓઝોન
4. વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
A) કાર્બન ડાયોક્સાઈડ B) કાર્બન મોનોક્સાઈડ
C) નાઈટ્રોજન D) હાઈડ્રોજન
5. જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...
A) ખુબ જ મોંઘી છે B) ઉત્પાદન ઘણું ધીમું હોય છે
C) તેનો સંચય કરવો સહેલો છે. D) તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી

GPSC પેપર - 2 - 2017

6. દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ?
A) નીચો માનવ વિકાસ B) મધ્યમ માનવ વિકાસ
C) ઊંચો માનવી વિકાસ D) ખૂબ ઊંચો માનવ વિકાસ
7. જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે - 900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?
A) સમતાપ આવરણ B) મધ્યાવરણ
C) ક્ષોભસીમાં D) ક્ષોભ આવરણ
8. વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુ સમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ?
A) ઠંડો વાતાગ્ર B) ઓકલુડેડ વાતાગ્ર
C) ગરમ વાતાગ્ર D) સ્થિર વાતાગ્ર
9. નીચે જણાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો.
1. ઑક્સિજન 2. નાઈટ્રોજન
3. કાર્બન ડાયોક્સાઈડ 4. આર્ગન
Codes :
A) 1, 2, 3 અને 4 B) 2, 1, 4 અને 3
C) 3, 4, 2 અને 1 D) 2, 1, 3 અને 4
10. પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને .... કહે છે.
A) ભૂજૈવરસાયણિક ચક્ર B) રાસાયણિક ચક્ર
C) જૈવિક ચક્ર D) બાયો ઓર્ગેનિક ચક્ર
11. "ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ?
A) જિમ કોરબેટ રાષ્ટ્રિય ઉદ્યાન B) કાન્હા ટાઈગર રીઝર્વ
C) કાજીરંગા રાષ્ટ્રિય ઉદ્યાન D) દૂધવા ટાઈગર રીઝર્વ
12. નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ?
A) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ B) પશ્ચિમ ઘાટ
C) પૂર્વ ઘાટ D) હિમાચલ પ્રદેશ
13. નેશનલ એકશન પ્લાન ઓન કલાઈમેટ ચેન્જ (NAPCC) હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઈન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં .... મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે.
A) 2 B) 3 C) 4 D) 5
14. "બ્લ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે?
A) ફોસ્ફેટ્સ B) સલ્ફર C) આર્સેનિક D) નાઈટ્રેટ
15. નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN - Decade on Biodiversity) છે ?
A) 2011-2020 B) 2016-2025 C) 2014-2024 D) 2005-2014
16. 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ .... સુધી વૈશ્વિક ગરમાવો (Global Warming) ટાળી શકે છે.
A) 0.5°C B) 0.25°C C) 1°C D) 2°C

1)B, 2)D, 3)D, 4)A, 5)D, 6)B, 7)B, 8)A, 9)B, 10)A, 11)B, 12)A, 13)D, 14)D, 15)A, 16)A.

GPSC MAINS પેપર - 2 - 2016

17. બ્લૂ મોરમોનને નીચેના પૈકી ક્યા રાજ્યના 'રાજ્ય પતંગિયા' તરીકે જાહેર કરવામાં આવેલ છે ?
A)સિક્કીમ B)મહારાષ્ટ્ર C)કર્ણાટક D)મેઘાલય
18. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી ક્યો સાચો જવાબ છે ?
A)મેલઘાટ ટાઈગર રિઝર્વ
B)બંદીપુર ટાઈગર રિઝર્વ
C)રણથંભોર ટાઈગર રિઝર્વ
D)ઉપરના તમામ

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

19. તાજેતરમાં ક્યા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ?
A)બિહાર B)મણીપુર
C)સિક્કિમ D)પશ્ચિમ બંગાળ
20. E waste Rules સરકાર દ્વારા ક્યા વર્ષથી અમલી બનાવવામાં આવ્યું?
A)ઈ.સ.2008 B)ઈ.સ.2009
C)ઈ.સ.2010 D)ઈ.સ.2012
21. ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત ક્યા વર્ષથી કરવામાં આવેલ છે ?
A)ઈ.સ.1983-84 B)ઈ.સ.1986-87
C)ઈ.સ.1990-91 D)ઈ.સ.1991-92

PSI GK - 1/1/2017

22. એસિડ વર્ષાના મુખ્ય ઘટકો ક્યા છે ?
A)સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ
B)કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
C)પોટેશિયમ સલ્ફેટ
D)કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ

GPSC પ્રિલિમ - 2001

23. આમાં લીલાં વૃક્ષો કપાતાં અટકાવવાની ચળવળ કઈ ?
A)ચીપકો આંદોલન
B)નર્મદા બચાવો આંદોલન
C)તહેરી બંધ આંદોલન
D)આમાનું એકેય નહીં

GPSC પ્રિલિમ - 2014

24. વૈશ્વિક દાહકતા (Global Warming) માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી ?
A)વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ
B)અતિવૃષ્ટિ
C)જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન
D)પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ

PSI ખાતાકીય - 23/04/2017

25. 'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ?
A)વધુ વૃક્ષો વાવો B)હરિયાળી ક્રાંતિ
C)વધુ અનાજ ઉગાડો D)ટપક સિંચાઈનો ઉપયોગ કરો

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

26. આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે?
A)25 % B)33 % C)50 % D)66 %
27. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓ અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
A)વન સંશોધન સંસ્થા B)સર્વે ઓફ ઈન્ડિયા
C)ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા
D)ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન
28. ભારતમાં ક્યા પ્રકારના જંગલોનું સૌથી વધુ છે?
A)ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
B)ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
C)સમશીતોષ્ણ કટિબંધીય જંગલો
D)ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો
29. મેહાંગની વૃક્ષ ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે છે?
A)સમશીતોષ્ણ કટિબંધીય B)ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર)
C)ઉષ્ણ કટિબંધીય વરસાદી D)ભરતીના જંગલો (મેન્ગ્રુવ)
30. જૈવ વૈવિધ્યની દૃષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃધ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે?
A)પ્રથમ B)ચતુર્થ C)આઠમું D)છઠ્ઠું

PSI/ASI GK - 2/5/2015

31. એસીડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?
A)કાર્બન મોનોકસાઈડ B)નાઈટ્રોજન ડાયોકસાઈડ
C)હાઈડ્રોજન D)સલ્ફર ડાયોકસાઈડ

17)B, 18)D, 19)C, 20)D, 21)A, 22)A, 23)A, 24)B, 25)A, 26)B, 27)C, 28)A, 29)C, 30)D, 31)D.

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

32. "જૈવિક આરક્ષિત ક્ષેત્ર" કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો?
A)યુનેસ્કો (UNESCO) B)યુનીસેફ (UNICEF)
C)યુનો (UNO) D)સિક્યુરીટી કાઉન્સીલ

33. દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે.
A)સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ B) WHO
C)સ્વાસ્થ્ય મંત્રાલય D) કાયદા મંત્રાલય

34. પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડુતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદુષણ થાય છે તે કયા પાકની વધેલી વસ્તુઓ છે?
A)ચોખા B)ચોખા અને ઘઉં
C)ચોખા અને રોકડીયા પાક D)ઘઉં અને રોકડીયા પાક

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

35. કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી ક્યા પ્રોટોકોલમાં થયો?
A)મોન્ટ્રીયલ પ્રોટોકોલ B) ક્યોટો પ્રોટોકોલ
C)પેરીસ પ્રોટોકોલ D)સી ઓલ પ્રોટોકોલ

GPSC Class - 2 - 18/12/2016

36. કૃત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે?
A)સિલ્વર મેગ્રેટાઈટ B)સિલ્વર ક્રોમાઈટ
C)સિલ્વર આયોડાઈડ D)સિલ્વર હેક્સાઈડ

GPSC Class - 2 - 12/2/2017

37. 1866 માં 'Ecology' શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજેલ હતો?
A)Charles Darwin B) Robert Whittaker
C) Arthur Tansley D) Ernst Haeckel

38. વિશ્વમાં Per Capita Emission of Carbon Dioxide કયો દેશ સૌથી વધારે કરે છે?
A)અમેરિકા B)ચીન
C)કતાર D)સાઉદી અરેબીયા

GPSC Class - 2 - 16/04/2017

39. પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે?
A)ગેમેક્સીન B)ડી.ડી.ટી. C) B.H.C D)D.M.T

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

40. વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ?
A)વરસાદ B)ગ્લોબલ વોર્મિંગ
C)જમીનનું ધોવાણ D)દુષ્કાળ

41. પર્યાવરણની ચર્ચા દરમિયાન 'SMP' શબ્દનો ઉપયોગ થાય છે. SMPનો અર્થ શું થાય છે ?
A)Suspended partial Matter
B) Suspended Particulate Matter
C) Suspended Pollutant mineral
D)ઉપરોક્ત પૈકી એકપણ નહીં

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

42. એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાંટ ધરાવતું સ્થળ કયું છે?
A)મહારાષ્ટ્રમાં સકરી B)મધ્યપ્રદેશમાં નીમચ
C)તામિલનાડુંમાં કામુથી D)ગુજરાતમાં ચરન્કા

43. એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian Scientific Expedition) (36-iSEA) નો મુખ્ય/ઝોક વિસ્તાર કયો છે?
A)વાતાવરણ ફેરફાર B)ભૂસ્ખલનનો અભ્યાસ
C)અશ્મિઓનો અભ્યાસ D)ભૂમિ સર્વેક્ષણ

44. શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂંક કરેલ છે?
A)GUDM B)નગરપાલિકા નિયામક
C) GMFB D) GUDC

45. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 કયાં સ્થળે યોજાઈ હતી?
A)પેરિસ B)ક્યોટા C)બોન D)મરાકેશ

46. ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે........હોય છે.
A)સલ્ફરના ઓક્સાઈડ
B)કાર્બન મોનોક્સાઈડ
C)નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઈડ્રોકાર્બન
D)રજકણીય પદાર્થો

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

47. નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
A)આઈસલેન્ડ B)ગ્રીનલેન્ડ C)મડાગાસ્કર D)ભૂતાન

32)A, 33)A, 34)A, 35)B, 36)C, 37)D, 38)C, 39)B, 40)A, 41)B, 42)C, 43)A, 44)D, 45)D, 46)C, 47)D.

GPSC Class - 2 - 18/03/2017

48. દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે?
A)4 B)5 C)6 D)7

49. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એક્ટ (Environmental Protection Act) ક્યારથી અમલમાં આવેલ હતો?
A)1980 B)1984 C)1986 D)1990

50. વાતાવરણમાં નાયટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે?
A)78% B)26% C)21% D)1%

GPSC Class - 1 - 28/01/2017

51. 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ?
A)30 % B)33 % C)25 % D)32 %

નાયબ ચિટનીશ - 02/06/2015

52. CFC એટલે........
A)કાર્બન ફ્લોરો કાર્બન B)ક્લોરો ફ્લોરો કાર્બન
C)કાર્બન ફેર કાર્બન D)ચેર ફ્લોરિન કાર્બન

GPSC Class - 2 - 16/04/2017

53. કાર્બન ક્રેડીટનો ખ્યાલ શામાંથી ઉદ્‌ભવેલ હતો?
A)પૃથ્વી સંમેલન - રીયો-ડી-જાનેરો
B)ક્યોટો-પ્રોટોકોલ
C)મોન્ટ્રીયલ પ્રોટોકોલ D)જી.8 સંમેલન

54. પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે?
A)12 સૌથી હાનિકારક વાયુઓ
B)12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો
C)12 સતત Persistent કાર્બનિક કેમીકલ પ્રદુષકો
D)ઉપરોક્ત પૈકી એક પણ નહીં

55. ભારતમાં નીચેના પૈકી કઈ જણસમાં સૌથી વધુ જૈવ વિવિધતા જોવા મળે છે?
A)કેરી B)સાગ C)ઘઉં D)બાજરી

56. ક્યા ટાઈગર રીઝર્વ માટે ભૂરસીંગ - ધી બારા સીંઘ (Bhoorsingh the Barasingha) ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે?
A)કાઝીરંગા B)કાન્હા ટાઈગર રીઝર્વ
C)ઈન્દ્રાવતી D)તાડોબા

GPSC Class - 2 - 02/04/2017

57. ભારત વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં ક્યું સ્થાન ધરાવે છે ?
A)સાતમુ, પાંચમું B)સાતમુ, ચોથુ
C)દસમું, પાંચમું D)દસમુ, ચોથું

58. કેલ્વિન ચક્ર શું છે ?
A)હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર
B)ખોરાકના પાચનનું ચક્ર
C)પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર
D)ઉપર પૈકી એક પણ નહીં

GPSC Class - 2 - 12/02/2017

59. વનસ્પતિની વિવિધતા દૃષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે?
A)પ્રથમ B)ચોથું C)પાંચમું D)સાતમું

GPSC Class - 1 - 09/04/2017

60. નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે?
A)કોલસો B)પેટ્રોલ C)ડિઝલ D)હાઈડ્રોજન

GPSC Class - 2 - 04/03/2017

61. ભારતના ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ?
A)ચંદીગઢ B)દીવ
C)અંદામાન તથા નિકોબાર D)પોંડીચેરી

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017)

62. વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ?
A)નૈતિક ફરજ B)રાજકીય ફરજ
C)સામાજિક ફરજ D)માનવીય ફરજ

GPSC Class - 2 - 11/12/2016

63. પખુ ટાયગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલ છે ?
A)આંધ્ર પ્રદેશ B)મધ્ય પ્રદેશ
C)અરૂણાચલ પ્રદેશ D)હિમાચલ પ્રદેશ

48)A, 49)C, 50)A, 51)B, 52)B, 53)B, 54)C, 55)A, 56)B, 57)D, 58)A, 59)B, 60)D, 61)D, 62)A, 63)C.

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

64. રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થાપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે?
A)રાષ્ટ્રપતિ
B)પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રિય મંત્રી
C)પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ
D)પ્રધાનમંત્રી

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

65. ઓઝોન શેમાં ઉપસ્થિત છે ?
A) અધોમંડળ B) ઊર્ધ્વમંડળ
C) મસોસ્ફીયર D) આઈનોસ્ફીયર

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

66. (NGT)નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ?
A) ઓક્ટોબર, 2010 B) જાન્યુઆરી, 2015
C) ફેબ્રુઆરી, 2011 D) નવેમ્બર , 2001

67. ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર(CEE)ક્યા આવેલી છે ?
A) કચ્છ B) જૂનાગઢ C) વલસાડ D) અમદાવાદ

GSSSB મિકેનિક - 2017

68. કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્ત્વનો સંદેશો આપે છે ?
A)રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો
B)દેવીપૂજાનો
C)પર્યાવરણની સુરક્ષાનો
D)મેઘ વિદ્યાની

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

69. વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને 'સંરક્ષિત વિસ્તાર' (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજયમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે?
A)મહારાષ્ટ્ર B)ગુજરાત C)રાજસ્થાન D)મધ્યપ્રદેશ

70. એસીડ વર્ષા (Acid Rain) માટે નીચે દર્શાવેલ પૈકી કયું મિશ્રણ જવાબદાર છે?
1) સલ્ફર ડાયોક્સાઈડ 2) કાર્બન મોનોક્સાઈડ
3) નાઈટ્રોજન ડાયોક્સાઈડ 4) કાર્બન ડાયોક્સાઈડ
A)(1) અને (3) B)(1) અને (2)
C)(2) અને (3) D)(1), (2) અને (3)

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

71. હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે?
A)ગ્રીન હાઉસ અસર
B)વાતાનૂકૂલન અસર
C)અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી
D)એસિડ વર્ષા અસર

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

72. નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ?
A)કાર્બન ડાયોક્સાઈડ B)ઓક્સિજન
C)હાઈડ્રોજન D)નાઈટ્રોજન

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017

73. નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો.
A)ઔદ્યોગિક પ્રક્રિયા B)થર્મલ પાવર પ્લાન્ટ
C)કૃષિ D)વાહન-વ્યવહાર

74. ડિઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો.
A)સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ
B)કણયુક્ત કચરો અને બેન્ઝીન
C)નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન
D)સલ્ફરડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ

ગ્રામસેવક વર્ગ - 3 - 2012

75. વાતાવરણમાં ક્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે ? - **નાઈટ્રોજન**

પ્રોબેશન ઓફિસર - 2016

76. ભીડ, પ્રદૂષણ, ઔદ્યોગિક ઘોંઘાટ વગેરે........મનોભારકો કહેવાય છે. - **પર્યાવરણજન્ય**

77. સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે ક્યા પ્રદૂષકનો ઉપયોગ થાય છે ? - **બીઓડી અને સીઓડી**

64)D, 65)B, 66)A, 67)D, 68)C, 69)B, 70)A, 71)A, 72)A, 73)B, 74)B.

તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓ - 2017

78. માછલીઘર એ ક્યા પ્રકારનું નિવસનતંત્ર છે ? - **કૃત્રિમ**

TET- II - સામાજિક વિજ્ઞાન - 2014

79. ''ચિપકો આંદોલન''ની નેતાગીરી કોણે લીધી હતી ? - **સુંદરલાલ બહુગુણા**
80. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદુષણ અટકાવવું જોઈએ ? - **વાતાવરણનું**
81. પૃથ્વીનું ક્યું આવરણ જોઈ શકાતું નથી ? - **વાતાવરણ**

PSI - 2012

82. વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે ક્યા વર્ષમાં એક્ટ પસાર કર્યો? - **1972**

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

83. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ક્યા પ્રકારની સંસ્થા છે ? - **અર્ધન્યાયિક સંસ્થા**
84. અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ શું છે ? - **કાર્સ્ટ વિસ્તારમાં નિક્ષેપાત્મક ભૂમિ આકારો**
85. રામસર સંમેલન કઈ બાબત સાથે સંબંધિત છે ? - **જળપ્લાવિત જમીનો**
86. મેઘાલયમાં ગારો ટેકરીઓનો ભાગ ઓળખાય છે ? - **નોકરેક**
87. ....નું મુખ્ય કારણ અશ્મિભૂત બળતણનું દહન છે. - **સલ્ફર ડાયોક્સાઈડ પ્રદૂષણ**
88. આંતર રાજકીય પર્યાવરણીય સ્રોતની જાળવણી ભારતની રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ.........નો ધ્યેય છે ? - **2006**
89. ગુજરાત જૈવ વૈવિધ્ય બોર્ડની રચના ભારત સરકારના જૈવ વૈવિધ્ય બોર્ડ, બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ ....મુજબ થઈ છે. - **2002**
90. વાયુ ગુણવત્તા સૂચકાંક અનુસાર સંતોષજનક સૂચકાંક કોને ગણવામાં આવે છે ? - **51થી 100**
91. ....પદ્ધતિથી વીજળી પેદા કરવામાં પર્યાવરણને નુકસાન થવા સંભવ છે. - **ન્યૂક્લિયર અને થર્મલ પાવર પદ્ધતિ**
92. નીલગિરિ જૈવ અનામત વિસ્તાર ક્યા રાજ્યમાં આવેલો છે ? - **તમિલનાડુ**
93. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યા એક્ટ અન્વયે કરાઈ છે ? - **NGT એક્ટ, 2010**
94. ક્યું ઈકોલોજિકલ ફૂટપ્રીંટનું એકમ છે ? - **ગ્લોબલ હેક્ટરસ**
95. કોર્ટેગેના પ્રોટોકોલ સંકળાયેલ છે - **જૈવ સુરક્ષા**
96. સિક્કિમમાં ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે ? - **કાંચનજંઘા**
97. ગરીબ માટે જીવનનિર્વાહ સુરક્ષા અને પર્યાવરણ શાસન કઈ નીતિનો ધ્યેય છે ? - **ભારતની રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ, 2006**
98. ધી ઈ-વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ) રૂલ્સ ક્યા વર્ષે જાહેર થયેલ ? - **2011**
99. નાગોયા પ્રોટોકોલ સંબંધિત છે ? - **જૈવ વિવિધતા**
100. ઓરિસ્સામાં મયુરભંજ જિલ્લાના ભાગમાં જૈવ આવરણ આવેલું છે ? - **સીમલીપાલ**
101. ....ઠલવાતો ઔદ્યોગિક કચરો નદીઓમાં તથા દરિયાની જીવસૃષ્ટિને નુકસાનકર્તા છે ? - **નદીઓમાં**
102. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ભારત સરકાર દ્વારા બ્લુ ફ્લેગ આપવામાં આવે છે આ ફ્લેગ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? - **સ્વચ્છ બીચની જાળવણી**
103. રોટર્ડમ સંમેલન યોજાયું હતું. - **જોખમી રસાયણો અને જંતુનાશકો**
104. પૃથ્વીની સપાટીથી ચડતા ક્રમે વાતાવરણના સ્તરોનો અનુક્રમ શું છે ? - **ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ, આયનાવરણ**
105. કાર્બન સીન્ક તરીકે કઈ બાબતોની જાળવણી કરવી જરૂરી છે ? - **વનોની**
106. પશ્ચિમ ઘાટમાં આવેલું કુદ્રેમુખ શું છે ? - **વિશ્વ પ્રસિદ્ધ જૈવ વિવિધતા ધરાવતું સ્થળ**
107. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી ? - **1974**
108. મેમાંગ નારંગ નામક ફળ ભારતના ક્યા રાજ્યમાં થાય છે ? - **મેઘાલય**
109. પર્યાવરણ માટે નુકસાનકારક ન હોય કે પછી હોય તેવી ઉત્પાદિત વસ્તુઓ માટેનું પ્રમાણભૂત ધોરણ ચિહ્ન એટલે ? - **ઈકોમાર્ક**
110. જીવંત સજીવ અને તેમના વાતાવરણ વચ્ચેના આંતરિક સંબંધના અભ્યાસને...... કહે છે. - **પરિસ્થિતિ વિજ્ઞાન (ઈકોલોજી)**
111. ત્રીજી પેઢીના જૈવ ઈંધણ એટલે શું ? - **લાલ-લીલી-નીલી લીલ શેવાળમાંથી મેળવાતું ઈંધણ**
112. કુદ્રેમુખ......... ખાણો માટે જાણીતું છે. - **નીકાસ કરવાની**
113. ભારત સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે લાગુ કરવામાં આવેલ ઉત્સર્જન માનક જણાવો. - **ભારત સ્ટેજ**
114. ભારતમાં થતા એકમાત્ર વાનર ગિબનની વિશિષ્ટતા જણાવો. - **તેના હાથ તેના પગ કરતા લાંબા હોય છે**

115. શહેરી વિસ્તારમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થાને યોગ્ય ક્રમમાં ગોઠવો. - **ભીનો અને અન્ય કચરો અલગ કરવો, એકત્રીકરણ, રિસાયક્લીંગ કરવું, બાયોમીથેનશન, લેન્ડ ફીલની જગ્યાએ કચરાને નાખવો.**

116. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટર ચેન્જના દસ્તાવેજ અનુસાર ભારતમાં રાષ્ટ્રિય સ્તરે હોવાના સરાસરી સપાટી તાપમાનમાં .... વધારો થાય છે. - **છેલ્લી સદીમાં 0.4પC**

117. ક્ષોભ આવરણમાં કાર્બન મોનોક્સાઈડની રાસાયણિક આયુ......છે. - **30થી 90 દિવસ**

118. સૌથી વધુ ખરાબ હવાનું પ્રદૂષણ શાનાથી થાય છે? - **સ્મોક (ધુમાડો)**

119. જૈવવિવિધતા ''હોટસ્પ્સ્પોટ'' એટલે શું ? - **પ્લાન્ટ એન્ડિમેઝમનું અસાધારણ સ્તરે અને નિવાસસ્થાન નુકસાનનું ગંભીર સ્તરે-એમ બન્ને લાક્ષણિકતાઓવાળો બાયોજીઓગ્રાફિક ક્ષેત્ર**

120. રાષ્ટ્ર સંઘ દ્વારા આયોજિત જૈવ વિવિધતા / જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટેના સંમેલન બાદ ભારતે ક્યો કાયદો ઘડ્યો છે ? - **બાયોલોજિકલ ડાયવર્સિટી (જૈવ વિવિધતા) અધિનિયમ, 2002**

121. જળવાયુ પરિવર્તન સામે વલણ લેવા સારુ વ્યક્તિઓને પ્રેરણા આપતું વિશ્વભરનું આંદોલન ક્યું છે ? - **અર્થ અવર આંદોલન**

122. મ્યુનિસિપલ ઘન કચરા નિયમ 2000ના કોઈપણ પ્રકારના ભંગ બદલ પર્યાવરણ (રક્ષણ) અધિનિયમ 1986ના કેટલામાં નિયમ અંતર્ગત દંડકીય જોગવાઈ છે ? - **29મો**

123. ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત ક્યા વર્ષથી કરવામાં આવેલ છે ? - **1983-84**

124. D.O. ટેસ્ટ અને B.O.D ટેસ્ટ શેનું પ્રમાણ માપવા માટે કરવામાં આવે છે ? - **પાણીની શુદ્ધતા**

125. વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરિનની હાજરી જાણવા માટેના ઓટી ટેસ્ટને શું કહેવામાં આવે છે ? - **ઓર્થોટાલીડીન ટેસ્ટ**

126. વાયુ પ્રદૂષણના પ્રદૂષકો જણાવો. - **CO_2, NO, SO_2, બેન્ઝીપાયરીન**

127. ધ્વનિ નિયંત્રણ માટે ક્યા ત્રણ પરિબળો પર અસરકારક પગલા લેવામાં આવે છે ? - **શ્રોતા પર નિયંત્રણ, સ્રોતનું નિયંત્રણ, માર્ગનું નિયંત્રણ**

128. ક્યોટો પ્રોટોકોલમાં દરેક દેશ 2008-2012 સુધીમાં સમગ્ર ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ 1990ના સ્તર કરતાં કેટલું ઓછું કરવા માટેના પગલા લે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી ? - **5%**

129. કઈ દિશામાંથી આવતો પ્રકાશ વધુ સ્થિર અને અસરકારક હોય છે ? - **ઉત્તર દિશા**

130. Smog (સ્મોગ) શું છે ? - **ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ**

131. વરસાદની આગાહી ક્યા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે? - **હવામાન ખાતુ**

132. નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોનો સમૂહ જણાવો. - **વનસ્પતિની પરાગરજ, લાલા ફાટવાથી પથરાતાં દ્રવ્યો, SPM**

133. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે અસ્તિત્વમાં આવ્યો ? - **1972**

134. વાતાવરણનું સૌથી નીચેનું સ્તર ક્યા નામે ઓળખાય છે ? - **ટ્રોપોસ્ફિયર**

135. સ્વતંત્રતા પછી જળ પ્રદૂષણ અંગેનો કાયદો ઘડનાર પ્રથમ રાજ્ય ક્યું છે ? - **ઓરિસ્સા**

136. પર્યાવરણમાં પ્રદૂષકોની ઉપસ્થિતિને સામાન્ય રીતે ppmમાં દર્શાવવામાં આવે છે. આ ppmનું પૂરું નામ શું છે ? - **પાર્ટસ પર મિલિયન**

137. ક્યા રાજ્યએ પર્યાવરણ પોષક બાંધકામને પ્રોત્સાહન આપવા હરિત બાંધકામ નિર્માણ પદ્ધતિ અપનાવી છે ? - **રાજસ્થાન**

138. ગ્લોબલ વોર્મિંગને વશમાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરેલ ધારાધોરણ (ક્યોટો પ્રોટોકોલ) ક્યા વર્ષથી અમલમા આવ્યા ? - **2005**

139. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન ક્યું છે ? - **ક્લોરોફ્લોરો કાર્બન**

140. કેન્દ્ર સરકાર દ્વારા ક્યા વર્ષમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવેલ હતી ? - **ઈ.સ.2010**

141. જળવાયુ પરિવર્તન માટે પ્રતિ વર્ષ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. તેનું પ્રથમ સંમેલન વર્ષ 1995માં ક્યા સ્થળે યોજવામાં આવેલ હતું ? - **બર્લિન**

142. હાથી ગણતરી-2017માં એશિયાઈ હાથીઓની સૌથી વધુ સંખ્યા ક્યા રાજ્યમાં જોવા મળેલ છે ? - **કર્ણાટક**

143. સમુદ્રી સૂક્ષ્મ જીવો અને લીલ પ્રાથમિક ઉત્પાદક હોય તેવી ખોરાક શ્રેણીના આખરી ઉપભોક્તા પસંદ કરો. - **મોટી માછલીઓ**

144. માનવજીવન અને વન્યજીવનમાં નિરુપદ્રવી અસ્તિત્વ સક્ષમ કરવાના હેતુ સાથે અર્થ અવર આંદોલન કઈ સંસ્થા દ્વારા આયોજિત છે ? - **વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF)**

145. ભારત સ્ટેજ ઉત્સર્જન માનાક.........ને લાગુ પડે છે. - **પરિવહન વાહનો**

146. રાજ્યના વન અહેવાલ-2011 (સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ-2011) પ્રમાણે ગુજરાતનો કુલ કેટલા ટકા વિસ્તાર વનાચ્છાદિત છે ? - **7.46%**

147. કાર્બન ક્રેડિટનો સરળ અર્થ બતાવો. - **ગ્રીન હાઉસ વાયુના સર્જનમાં ઘટાડા સામે મળતું વળતર**

148. વાતાવરણમાં કાર્બનડાયોક્સાઈડની માત્રા વધતા કઈ અસર થાય છે ? - **તાપમાનમાં વધારો**

149. જમીનને સૌથી વધુ પ્રદૂષિત કરનાર પરિબળ ક્યું છે ? - **પ્લાસ્ટિક**

150. ભારતની એવી કઈ ઈમારત છે કે જેણે ભારતમાં પ્રથમ ટ્રેડમાર્ક મેળવેલ છે ? - **તાજમહાલ પેલેસ હોટલ**

151. પર્યાવરણમાં ક્રાંતિકારી શોધ કરનાર શૈક્ષણિક સંસ્થા કે જ્યાં એડમિશન માટે વધુમાં વધુ નાપાસ થનારને એડમિશનમાં અગ્રતા મળે છે તેવી સોનમ-વાંગચૂક સ્થાપિત સંસ્થા ક્યા આવેલી છે ? - **લડાખ**

152. ક્યા પાકમાં રહેલી મૂળ-ગંડિકા હવામાના નાઈટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન કરે છે ? - **દ્વિદળી કઠોળ**

153. ક્યા વાયુઓ હવામાનની ગરમી વધારતી ગ્રીન હાઉસ અસર કરે છે ? - **કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, ક્લોરોફ્લોરો કાર્બન**

154. સોલિડ વેસ્ટ નિકાલની કઈ પદ્ધતિ પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ છે ? - **કમ્પોસ્ટિંગ**

155. નદીમાં માછલીઓ મરી ન જાય તે માટે D.Oનું પ્રમાણ ઓછામાં ઓછું .... હોવું જોઈએ. - **4 ppm**

156. ક્યા આંદોલનનો હેતુ લોકોને તેમના બિનઆવશ્યક ઉપકરણો બંધ કરવા પ્રોત્સાહિત કરી સંરક્ષણ અને ટકાઉ ઊર્જાને ઉત્તેજન આપવાનો છે ? - **અર્થ અવર આંદોલન**

157. સેવ (SAVE) કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે ? - **ગીધ**

158. વીજળીનો ક્યો સ્ત્રોત પ્રદૂષણમુક્ત છે? - **પવન ચક્કી**

159. વર્ષ 2016માં ભારતે સહી કરેલ પેરિસ કરારના મુખ્ય તત્ત્વ ક્યા છે ? - **ગ્રીન હાઉસ ગેસ પર નિયંત્રણ**

160. ભારત વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના ક્યારે કરી ? - **1985**

161. ઈકો સિસ્ટમમાં ઊર્જાનો પ્રવાહ અને રાસાયણિક પોષક તત્ત્વોના પ્રવાહ વચ્ચેના સૌથી મોટો તફાવત એ છે કે... - **પોષક તત્ત્વોનું પુનઃ નવીનીકરણ કરવામાં આવે છે પરંતુ હસ્તાક્ષર કરવા માટે મુખ્ય ઉદ્દેશ છે.**

162. બાયોસ્ફીયર અનામત પ્રદેશ કઈ સંશોધન પ્રવૃત્તિ અને પર્યાવરણીય શિક્ષણના વિકાસની મંજૂરી આપી છે ? - **મધ્યમવર્તી ક્ષેત્ર**

163. ભારતમાં પર્યાવરણીય રક્ષણ કાયદો વર્ષ......માં પસાર કરવામાં આવ્યો હતો. - **1986**

164. ક્યું સંયોજક ગ્રીનહાઉસ ગેસ માટે યોગ્ય છે ? - **CO_2, CH_4, CFC, NO_2**

165. ક્લાઈમેક્સ સ્ટેજની સ્થાપનાને........ તરીકે ઓળખવામાં આવે છે. - **સ્થિરીકરણ**

166. સ્વચ્છ સર્વેક્ષણ - 2018 અંતર્ગત લીલા રંગની કચરા ટોપલીમાં નીચે પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે ? : **સડેલાં ફળ**

167. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યાં આવેલું છે ? : **અમદાવાદ**

168. 'મારી આસપાસ' નામનું પાઠ્યપુસ્તક ક્યા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે ? : **ધોરણ - 3**

169. અમદાવાદ શહેરમાં વાહન નોંધણી માટે નીચે પૈકી ક્યો માપદંડ રાખવામાં આવેલ છે ? : **BHARAT - III**

170. 1991ની ઔદ્યોગિક નીતિ અન્વયે .... **લાખથી** વધુ વસ્તી ધરાવતા **સ્થળે** પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો **સ્થાપી** શકાશે નહીં. : **10 લાખ**

171. ઈ-વેસ્ટ (મેનેજમેન્ટ અને હેન્ડલિંગ) રૂલ્સ સરકાર દ્વારા ક્યા વર્ષથી અમલી બનવાયેલા છે ? - **2012**

172. વેમબન્દ જૈવ અનામત વિસ્તાર ક્યા રાજ્યમાં છે ? - **કેરળ**

173. આબોહવા પરિવર્તન અંગે સંશોધન કરતી 'IPCC - Intergovernmental Panel On climate change'ની રચના નીચે પૈકી કઈ સંસ્થા/ઓ દ્વારા થઈ હતી ? - **વિશ્વ મૌસમ સંગઠન અને યુ.એન.ઈ.પી. (UNEP)**

174. પૃથ્વી ઉપરના તાપમાનના વિતરણમાં ક્યું સૌથી અગત્યનું અસરકર્તા ઘટક છે ? - **અક્ષાંશ**

175. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સીઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી પુસ્તિકામાં ગહન સંકટગ્રસ્ત જીવોને ક્યા રંગના પૃષ્ઠો પર દર્શાવવામાં આવે છે ? - **ગુલાબી**

176. આગામી પેઢીને સ્વચ્છ અને લીલુ પર્યાવરણ પુનઃ સ્થાપિત કરીને પરત આપવાના તેમજ લોકો અને વિદ્યાર્થીઓને જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ અંગે સંવેદનશિલ બનાવવા ભારત સરકારે શરૂ કરેલું અભિયાન ક્યું છે ? - **ગ્રીન ગુડ ડીડ્સ અભિયાન**

જાહેર વહીવટ

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ?
A) રાજકીય B) વહીવટી C) સામાજિક D) કાયદાકીય
2. ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ ક્યા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?
A) જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય
B) દિલ્હી વિશ્વવિદ્યાલય
C) લખનઉ વિશ્વવિદ્યાલય D) હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
3. નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રસી (bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ?
A) કોરીયન B) ફ્રેન્ચ C) સ્વીડિશ D) પર્સીયન
4. ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?
A) લોર્ડ રીપન B) લોર્ડ વોરન હેસ્ટિંગ્સ
C) લોર્ડ માઉન્ટબેટન D) લોર્ડ ક્લાઈવ

GPSC MAINS પેપર - 1 - 2016

5. 'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે?
A) વુડ્રો વિલ્સન B) ડ્વાઈટ વાલ્ડો
C) માર્શલ ઈ. ડીમોક D) એફ.એમ.માર્કસ
6. સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યાવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી?
A) હરમન ફીનર B) ઈ.એન.ગ્લેડન
C) ઓ.જી.સ્ટાહેલ D) બી.ફિલપ્પો
7. વ્યવસ્થાતંત્રઅને પદ્ધતિ (ઓ અને એમ) વિભાગ કેબિનેટ સચિવાલયમાં ક્યા વર્ષમાં ઊભો કરવામાં આવ્યો ?
A) 1952 B) 1954 C) 1956 D) 1960
8. 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ?
A) ક્રિસ્ટોફર પોલીટ B) એન્ડુ મેસી
C) ક્રિસ્ટોફર હુડ D) ડેવિડ ઓસબોર્ન
9. 14મા નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ?
A) ડૉ.વાય.વી.રેડ્ડી B) ડૉ.એમ.ગોવિંદરાવ
C) સુશ્રી સુષ્માનાથ D) શ્રી અજય નારાયણ ઝા
10. નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken Window Syndrome' વપરાય છે ?
A) પોલીસ સત્તા B) ન્યાયિક સત્તા
C) કારોબારી સત્તા D) પ્રસાર માધ્ય (મીડિયા)
11. નીચેના પૈકી ક્યું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ)ની અસર બાબતે સાચું નથી ?
A) સેવાઓના બાહ્ય કરાર B) જાહેર ક્ષેત્રમાં વિનિવેશ
C) કોર્પોરેટ સંચાલન D) રાજ્યની વધુ ભૂમિકા
12. હેયઝ અને કીઅર્ની (Hays and Kearney)ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી ક્યો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ?
A) કદ ઘટાડો (Down Sizing) B) લોકશાહીકરણ
C) વિકેન્દ્રીયકરણ D) બિન અમલદારીકરણ
13. ભારત સરકાર દ્વારા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (TRAI)ની સ્થાપના નીચેના પૈકી ક્યા વર્ષમાં કરવામાં આવી ?
A) 1995 B) 1997 C) 1998 D) 2000
14. વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું ક્યું મંત્રાલય/સંસ્થા સંભાળે છે ?
A) કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
B) ગૃહ મંત્રાલય
C) પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ)
D) વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.)
15. નીચેની પૈકી ક્યું જાહેર-ખાનગી ભાગીદારી (PPP - Public Private Partnership)નું ઉદાહરણ નથી ?
A) Build Operate, Own and Transfer (BOOT)
B) Build Operate and Own (BOO)
C) Build Operate and Transfer (BOT)
D) Design, Build, Finance, Operate and Own (DBFOO)
16. 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?
A) ઓસબોર્ન અને ગેબલર B) લેન અને રોસનબ્લૂમ
C) હુડ D) પોલીટ
17. સી.પી.એમ. (CPM)એટલે ?
A) ક્રિટીકલ પ્રોસીજર મેથડ B) ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ
C) ક્રિટીકલ પ્રોસેસ મેથડ D) ક્રિટીકલ પાથ મેથડ
18. 'ન્યુ ડેસ્પોટીઝમ' (New Despotism) કોણે લખ્યું ?
A) અર્નેસ્ટ ફરન્ડ B) ડબલ્યુ.એ.રોબસન
C) એલ.ડી.વાઈટ D) લોર્ડ હેવાર્ટ
19. નીચેના પૈકી ક્યા વર્ષો દરમિયાન સૌપ્રથમવા સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડિંગ (Memorandum Of Understanding- MOU)ની પદ્ધતિ દાખલ કરવામાં આવી ?
A) 1986-1987 B) 1987-1988
C) 1998-1999 D) 2000-2001

1)B, 2)C, 3)B, 4)B, 5)C, 6)A, 7)B, 8)C, 9)A, 10)A, 11)D, 12)B, 13)B, 14)A, 15)D, 16)B, 17)D, 18)D, 19)B.

20. 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી ક્યા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ?

A) 1962 B) 1963 C) 1966 D) 1968

21. નીચેનામાંથી ક્યું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

A) કેન્દ્રીય સીધા કર બોર્ડ B) રીઝર્વ બોર્ડ ઓફ ઈન્ડિયા

C) ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ

D) વિનિવેશ ખાતું

22. સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F'ની વિભાવનાનો અર્થ શું છે ?

A) ફંડીંગ, ફંકશન્સ અને ફીડબેક B) ફોર્સીસ, ફીડબેક અને ફંડીંગ

C) ફંકશનીંગ, ફાસ્ટ અને ફેડ્સ D) ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ

GPSC MAINS પેપર - 2 - 2016

23. ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ....ભાષાનો શબ્દ છે.

A) સંસ્કૃત B) ફ્રેન્ચ C) ગ્રીક D) લેટિન

24. નાગરિક અધિકાર પત્રનો (Citizen`s Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

A) જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી

B) કંઈક ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા

C) સરકારી અધિકારીઓ સાથે કી રીતે સંપર્કમાં આવવું

D) ઉપરના તમામ

25. લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો?

A) 16-01-2013 B) 16-01-2014

C) 14-04-2013 D) 16-04-2014

26. 'લોકપાલ અને લોક આયુક્ત કાયદા, 2013' અનુસાર લોકપાલમાં તેના ચેરમેન સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ?

A) 4 B) 6 C) 8 D) 10

PSI GK - 4-3/5-3/2017

27. હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકાડમીની સ્થાપના [illegible]

A) 1970 B) 1975 C) 1980 D) 198[illegible]

બિન સચિવાલય ક્લાર્ક - 2016

28. 'સ્વાગત' પ્રોજક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય[illegible] ફરિયાદીને સાંભળે છે ?

A) દર મહિનાના પ્રથમ સોમવારે B) દર મહિનાના [illegible]

C) દર મહિનાના ત્રીજા બુધવારે D) દર મહિનાના [illegible]

29. જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ?

A) કાયદા વિભાગ B) સામાન્ય વહીવટ વિભાગ

C) કૃષિ વિભાગ D) મહેસૂલ વિભાગ

30. કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

A) એન.ગોપાલસ્વામી આયંગર B) એ.ડી.ગોરવાલા

C) બી.આર.આંબેડકર D) સરદાર પટેલ

31. ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA)ના પ્રણેતા કોણ હતા ?

A) ડૉ.રાજેન્દ્રપ્રસાદ B) એસ.બંગરપ્પા

C) પં.જવાહરલાલ નેહરુ D) સર્વપલ્લી રાધાકૃષ્ણન

32. ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ.ટ્રેઈનીંગ સેન્ટરનું નામ જણાવો.

A) આદિત્ય બીરલા આઈ.એ.એસ.ટ્રેઈનીંગ સેન્ટર

B) એ.ડી.શોધન આઈ.એ.એસ.ટ્રેઈનીંગ સેન્ટર

C) વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ.ટ્રેઈનીંગ સેન્ટર

D) એસ.રાજગોપાલાચારી આઈ.એ.એસ.ટ્રેઈનીંગ સેન્ટર

33. "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

A) ક.મા.મુનશી B) જવાહરલાલ નેહરુ

C) બી.આર.આંબેડકર D) લાલબહાદુર શાસ્ત્રી

34. TRAI ની સ્થાપના ક્યારે થઈ ?

A) 1999 B) 1997 C) 1992 D) 2002

35. ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

A) અસંગઠિત ક્ષેત્ર B) ખેતી

C) ઉદ્યોગ ક્ષેત્ર D) માળખાગત સવલતો

36. સનદી સેવા"પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ"એવું કોણે કહ્યું છે ?

A) બી.આર.આંબેડકર B) જગજીવનરામ

C) જવાહરલાલ નેહરુ D) સરદાર પટેલ

37. "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"-આ વિધાન કોનું છે ?

A) મહાત્મા ગાંધી B) જયપ્રકાશ નારાયણ

C) સરદાર પટેલ D) વિનોબા ભાવે

38. ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ?

A) 2012 B) 2011 C) 2009 D) 2014

20)C, 21)D, 22)D, 23)D, 24)D, 25)B, 26)C, 27)B, 28)B, 29)D, 30)B, 31)C, 32)B, 33)A, 34)B, 35)D, 36)D, 37)B, 38)B.

બિન સચિવાલય કલાર્ક - 21/12/2014

39. આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે?
A) નાણાં પંચની ભલામણ દ્વારા
B) રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
C) ભારત સરકારના ઠરાવ દ્વારા
D) સોલિસિટર જનરલની સલાહ અનુસાર

40. આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે?
A) દિલ્હી B) મસૂરી C) હૈદરાબાદ D) દાર્જીલીંગ

41. ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?
A) મુખ્યપ્રધાન B) મંત્રીશ્રી C) સચિવાલય D) કલેક્ટર

42. 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism)ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ?
A) ન્યાયિક સમીક્ષા B) બંધારણ સુધારો
C) જાહેરહિતની અરજીઓ D) ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય

43. સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે?
A) રાજકીય B) વહીવટી C) સામાજિક D) કાયદાકીય

44. વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?
A) સર્વાનુમતે લેવાય B) બહુમતીથી લેવાય
C) અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય
D) ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

45. જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?
A) પ્રજાનું કલ્યાણ કરવાનું
B) વહીવટદારોનું કલ્યાણ કરવાનું
C) કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
D) ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું

46. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?
A) લૉ યુનિવર્સિટી B) આંબેડકર યુનિવર્સિટી
C) ગુજરાત યુનિવર્સિટી D) દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

PSI ખાતાકીય - 23/04/2017

47. વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?
A) સર્વાનુમતે લેવાય B) બહુમતિથી લેવાય
C) અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય D) ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

48. 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનુ તમારું બધુ સાચવી લેશે'- આ વિધાન કોણે કહ્યું હતું ?
A) ફેડરિક ટેલરે B) પીટર ડ્રકરે C) આર્ગરિશે D) પ્રો. ઉર્વિક

49. દોરવણીના મુખ્યત્વે કેટલા તત્વો છે ?
A) ચાર B) ત્રણ C) બે D) એક

50. એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ/આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?
A) પાઈ આકૃતિ B) વૃતાંશ આલેખ
C) પાસ પાસેની સ્તંભઆકૃતિ D) સ્તંભાકૃતિ

51. 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ?
A) ડૉ. જ્યોર્જ આર. ટેરી B) લ્યુથર ગ્યુલીક
C) વોર્ન અને જોસેફ મેસી D) ન્યુમેન અને સમર

52. કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ?
A) દસ્તાવેજ B) અહેવાલ C) પત્ર D) રજા રિપોર્ટ

53. ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ?
A) સ્વતંત્રપણે B) સંયુક્તપણે
C) A અને B બન્ને D) ઉપરોક્ત એકપણ નહી

54. માહિતીની આપ-લે.............
A) એકમાર્ગી પ્રક્રિયા છે B) સમકક્ષ પ્રકિયા છે
C) દ્વિમાર્ગી પ્રક્રિયા છે D) ઉપરોક્ત પૈકી એકપણ નહી

55. વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?
A) ધંધાના પ્રકારોને B) સંસ્થાના માળખાને
C) ઔદ્યોગિક સંબંધોને D) મજુરીની નીતિને

56. કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ?
A) માહિતી પ્રેષણ B) માહિતી સંચાર
C) અંકુશ D) દોરવણી

GSSSB હેડ કલાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

57. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?
A) મુખ્ય પ્રધાન B) રાજ્યપાલ
C) મુખ્ય સચિવ D) પ્રભારી મંત્રી

58. સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપના અધ્યક્ષસ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?
A) રાહત કમિશર B) CEO-GSDMA
C) મુખ્ય સચિવ D) રાહત નિયામક

39)C, 40)B, 41)C, 42)C, 43)B, 44)D, 45)A, 46)D, 47)D, 48)D, 49)A, 50)D, 51)B, 52)B, 53)B, 54)C, 55)B, 56)A, 57)C, 58)C.

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

59. 'પ્રશાસનિક પ્રક્રિયા સાર્વત્રિક છે' કોણે કહ્યું છે ? - **હેનરી ફેયોલ**
60. કાર્ય નિદર્શન પદ્ધતિ, સમય અધ્યયન પદ્ધતિ અને અનુભવજન્ય પદ્ધતિ કઈ રીત છે? - **કાર્ય-માપણી-કાર્ય સંચાલનની**
61. 'પ્રશાસન એ સરકારનો આધાર છે, પ્રશાસન વગર કોઈ સરકાર અસ્તિત્વ ધરાવી શકે નહીં.' - **પૌલ એચ.એપલબી**
62. રાજ્ય સરકારની થિંક ટેંક અને બ્રેઈન ટ્રસ્ટ તરીકે સેવા આપે છે? - **રાજ્ય સચિવાલય**
63. તાલીમ, સુધારા, ટેક્નોલોજી, લોકશાહી મૂલ્યો કઈ પદ્ધતિઓ છે ? - **ક્ષમતા નિર્માણ**
64. 'પ્રશાસનનો ખરો હાર્દ મૂળભૂત સેવા છે કે જે લોકો માટે પૂરી પાડે છે' - **ફેલીક્સ એ.નીગ્રો**
65. 'જો આપણી સંસ્કૃતિ પડી ભાંગી તો તે મુખ્યત્વે પ્રશાસનની નિષ્ફળતાના કારણે હશે' - **ડબલ્યુ બી.ડોનહેમ**
66. રાજ્ય સરકારનું ક્યું અંગ નિયામકો અને ક્ષેત્ર એજન્સીઓને નિર્દેશન અને માર્ગદર્શન આપે છે ? - **રાજ્ય સચિવાલય**
67. રાજ્ય પ્રશાસનની મુખ્ય સંકલન એજન્સી કઈ છે? - **રાજ્ય સચિવાલય**
68. જિલ્લા કક્ષાની હિસાબ-તપાસણી સમિતિની રચના દ્વારા સ્થાનિક સંસ્થાઓમાં ઉત્તરદાયિત્વ અને પારદર્શકતાની ખાતરી કરવી જોઈએ. આવું સૂચન કોણે કર્યું હતું ? - **બીજો વહીવટી સુધારણા આયોગ**
69. 'બે એકમો (રાજ્ય અને જિલ્લા) વચ્ચે પ્રશાસનના મધ્યવર્તી સ્તરની કોઈ જરૂર નથી' એવી ભલામણ કોણે કરી હતી? - **બીજું વહીવટી સુધારણા પંચ**
70. જિલ્લા સ્તરે જિલ્લા કલેક્ટરની સમગ્ર દેખરેખ હેઠળ ખાસ તકેદારી સેલ ઊભું કરવાની ભલામણ કોણે કરી ? - **બીજું વહીવટી સુધારણા પંચ**
71. કેટલીક નિશ્ચિત જવાબદારીઓ લગતી કલેક્ટરની ભૂમિકા એક રાજ્ય કરતા બીજા રાજ્યમાં બદલાતી હોય છે. કઈ એક ભૂમિકા અલગ અલગ રાજ્યોમાં એકસરખી છે તે પસંદ કરો. - **અન્ન અને નાગરિક પુરવઠો**
72. સંઘ લોક સેવા આયોગ (UPSC)ની મુલ્કી સેવાની પરીક્ષાઓમાં સુધારણા અંગે વર્ષ 2015માં રચાયેલ તજજ્ઞ સમિતિના અધ્યક્ષ કોણ છે ? - **બી.એસ.બાસવાન**
73. 'મૂલ્યો અને નૈતિક સંહિતાના આધારે જાહેર સેવકો માટેના વર્તણૂક નિયમો ફરીથી બનાવવા જોઈએ' એવી હિમાયત કોણે કરી? - **કર્મચારીગણ પ્રશાસનના નવીનીકરણ પરનો બીજા વહીવટી સુધારણા પંચનો અહેવાલ**
74. બીજા વહીવટી સુધારણા પંચે ભાર મૂક્યો કે સનદી સેવકો વિરુદ્ધ શિસ્તભંગના કેસોમાં યુ.પી.એસ.સી.(UPSC) સંઘ લોક સેવા આયોગ સાથેનો પ્રરામર્શ ફક્ત ક્યા કિસ્સામાં ફરજિયાત હોવો જોઈએ. - **ફક્ત બરતરફી અને રૂખસદ**
75. ભારતમાં કેન્દ્ર સ્તરે લોકપાલની સંસ્થા અને રાજ્ય સ્તરે લોકાયુક્તની સંસ્થાની સ્થાપનાની ભલામણ કઈ સમિતિએ/ આયોગે/ અહેવાલે કરી હતી ? - **પ્રથમ વહીવટી સુધારણા પંચનો અહેવાલ**
76. ક્યા કાર્યક્રમમાં સામાજિક અન્વેષણ (Social Audit)નું પ્રથમ વખત સંપૂર્ણ અને કાયદાકીય રીતે અમલીકરણ થયું ? - **મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MNREGA)**
77. કાર્યક્રમ, મૂલ્યાંકન અને સમીક્ષા રીત કોના દ્વારા વિકસાવવામાં આવી ? - **યુ.એસ.નૌકાદળના ઈજનેરો**
78. 'પ્રશાસન કાયદો એ લો કાયદાનો એવો ભાગ છે કે જે તંત્ર સુનિશ્ચિત કરે છે અને વહીવટી સત્તાઓનું સામર્થ્ય નક્કી કરે છે તેમજ હક્કોના ઉલ્લંઘન માટેના ઉપાયોનો નિર્દેશ કરે છે' પ્રશાસનની આ વ્યાખ્યા કોના દ્વારા આપવામા આવી છે ? - **એફ.જે.ગુડનોવ**
79. 'સંસદે રાજ્યોમાં આંતર રાજ્ય વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહિત કરવા માટે આંતરરાજ્ય વેપાર અને વાણિજ્ય આયોગની સ્થાપના કરવા સારૂ પગલા લેવા જોઈએ' કોણે આ ભલામણ કરી હતી ? - **બંધારણની કાર્યપદ્ધતિની સમીક્ષા માટેના રાષ્ટ્રીય પંચ**
80. ભારતમાં ક્યું મંત્રાલય સંયુક્ત પરામર્શ વ્યવસ્થા માટેનું મૂળ પ્રશાસનીક મંત્રાલય છે ? - **કર્મચારીગણ, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય**
81. વિતરણ નીતિઓ, પુનઃ વિતરણ નીતિઓ, મૂડીકરણ નીતિઓ કઈ નીતિનો પ્રકાર છે ? - **જાહેર નીતિ**
82. ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ. ટ્રેઈનીંગ સેન્ટરનું નામ જણાવો. - **એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઈનીંગ સેન્ટર**
83. ......એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારેયુક્ત બનાવવામાં આવે છે. - **કાર્ય સમૃદ્ધિકરણ**
84. જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજરને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ? - **સત્તાની સોંપણી**
85. સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? - **અનુભવના નિચોડ**
86. ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? - **આંતરિક અંકુશ**
87. સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? - **કાર્યક્ષમતા ઓડીટ**
88. સામુહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શક્તિશાળી મીડિયાનું ઉદાહરણ જણાવો. - **ટેલિવિઝન**
89. ભરતી કાર્યવાહીમાં સંઘ જાહેર સેવા આયોગનું આખરી કાર્ય ...... છે. - **પ્રમાણપત્રીકરણ**
90. સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? - **વહીવટી**
91. રૉ (RAW) (રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ) કોનો હિસ્સો છે? - **કેબિનેટ સચિવાલય**
92. એક્સટર્નલ પબ્લિસિટી એન્ડ પબ્લિક ડિપ્લોમસી (XPD) વિભાગ ભારતના ક્યા મંત્રાલયનો હિસ્સો છે ? - **વિદેશી બાબતોનું મંત્રાલય**
93. કોણે જાહેર નીતિને 'સરકારો જે કંઈ પણ કરવાનું કે ન કરવાનું પસંદ કરે તે' મુજબ વ્યાખ્યાયિત કરી છે ? - **થોમસ આર ડાય**
94. દરેક મંત્રાલયમાં નીતિ ઘટકોની સ્થાપના કરવાની ભલામણ કોની છે? - **પ્રથમ વહીવટી સુધારણા આયોગ**
95. આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ)ની ટ્રેઈનીંગ ક્યા આપવામાં આવે છે ? - **મસૂરી**
96. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહિવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? - **દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી**
97. જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? : **પ્રજાનું કલ્યાણ કરવાનું**
98. TQMનું પૂરું નામ જણાવો. : **ટોટલ ક્લોલિટી મેનેજમેન્ટ**
99. કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌપ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? : **હાર્વર્ડ**

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન

સચિવાલય સિનિયર કલાર્ક - 13/08/2017

1. ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?
   A) મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
   B) મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
   C) મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
   D) મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
2. ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ?
   A) 2007 B) 2005 C) 2003 D) 2002
3. દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?
   A) લેન્ડ ફોલ B) ઓસન ફોલ
   C) મોન્સ્ટર ફોલ D) અર્થ ફોલ
4. કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ?
   A) 5મા ઝોનમાં B) 7મા ઝોનમાં
   C) 6મા ઝોનમાં D) 10મા ઝોનમાં

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

5. જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAFને બોલાવવામાં આવે છે તેનું આખું નામ શું છે ?
   A) Ready Armed Force B) Rajya Armed Force
   C) Rapid Armed Front D) Rapid Action Force

GPSC MAINS પેપર - 2 - 2016

6. ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Erthquake Early Warning System) દેશના ક્યા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ?
   A) ઉત્તર પ્રદેશ B) ગુજરાત C) ઉત્તરાખંડ D) મહારાષ્ટ્ર

કોન્સ્ટેબલ - 2015

7. આગ બૂઝાવવામાં ક્યો ગેસ વપરાય છે ?
   A) નિયોજન B) નાઈટ્રોજન
   C) કાર્બન ડાયોક્સાઈડ D) કાર્બન મોનોક્સાઈડ

GPSC પ્રિલિમ - 2001

8. ગુજરાત માટે ગોઝારો દિવસ
   A) 26-1-2001 B) 31-10-1983
   C) 27-5-1964 D) 30-1-1948

GPSC પ્રિલિમ - 2007

9. 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ?
   A) ચાઈનીઝ B) કોરિયન C) જાપાનીઝ D) મલેશિયન

GPSC પ્રિલિમ - 2014

10. જીવન રક્ષક જેકેટ (Life Saving Jacket) કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે ?
    A) પૂર B) ભૂસ્ખલન C) ભૂકંપ D) આગ
11. ગુજરાતને અસરકર્તા ભૂકંપ - 2001નું ઉદ્‌ગમ બિંદુ (epicentre) ક્યાં હતું ?
    A) અંજાર પાસે - કચ્છ જિલ્લામાં B) મુંદ્રા પાસે - કચ્છ જિલ્લામાં
    C) બચાઉ પાસે - કચ્છ જિલ્લામાં D) લખપત પાસે - કચ્છ જિલ્લામાં
12. ક્યા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો ?
    A) તમિલનાડુ B) મહારાષ્ટ્ર C) ગુજરાત D) ઓરિસ્સા
13. સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ?
    A) NOAA B) COPS C) DART D) PMEL

PSI ખાતાકીય - 23/04/2017

14. ભૂકંપની તીવ્રતા ક્યા સ્કેલમાં માપવામાં આવે છે ?
    A) ચો.મી. B) અંશ C) રીક્ટર સ્કેલ D) મી.મી.
15. મચ્છુ જળહોનારતમાં સૌથીવધારે નુકસાન ક્યા શહેરને થયું હતું?
    A) મોરબી B) ધ્રાંગધ્રા C) જામનગર D) રાજકોટ

GPSC Class-1 - 2016

16. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે?
    A) મુખ્યમંત્રી B) મુખ્ય સચિવ
    C) મહેસૂલ સચિવ D) મહેસૂલ મંત્રી

1)D, 2)B, 3)A, 4)A, 5)D, 6)C, 7)C, 8)A, 9)C, 10)A, 11)C, 12)C, 13)C, 14)C, 15)A, 16)A.

GPSC Class - 1 - 28/01/2017

17. પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું ક્યું પાણી ગાળીને વાપરશો?
A)બે વાર ગાળેલું B) વહેતા પ્રવાહનું
C)ચોખ્ખું દેખાતું D)ઉકાળેલું

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

18. ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમા આવી હતી ?
A)અરવલ્લી B)સહ્યાદ્રિ C)વિંધ્ય D)હિમાલયન

GSSSB સર્વેયર - 2016-17

19. 'જી.એસ.ડી.એમ.એ.'નું આખું નામ શું છે ?
A)ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી
B)ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી
C)ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી
D)ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

20. ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?
A)ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
B)સ્થળાંતર કરવું.
C)ભૂકંપપ્રૂફ મકાનો/રહેઠાણોનું બાંધકામ
D)ઉપરના ત્રણ પૈકી એકપણ યોગ્ય નથી.

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

21. 'લાઈફ સેવિંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ?
A)પૂર B)ધરતીકંપ C)દુષ્કાળ D)વાવાઝોડુ

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

22. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે?
A)રાષ્ટ્રપતિ B)વડાપ્રધાન C)સંરક્ષણમંત્રી D)ગૃહમંત્રી

ટુજટુક

23. ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષમાં અમલી બનાવ્યો ? - 2005
24. 'લાઈફ સેવિંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? - પુર
25. ભૂકંપની તીવ્રતા ક્યા સ્કેલમાં માપવામાં આવે છે ? - રીક્ટર સ્કેલ
26. 'ધરતીકંપ'ને કેવા પ્રકારની આપત્તિ કહી શકાય? - કુદરતી આપત્તિ
27. 'શાળા સલામતી કાર્યક્રમ'માં વિદ્યાર્થીઓને આપત્તિ સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ?- મોકડ્રીલ
28. આપત્તિ સંચાલનમાં ક્યા સંસાધન ઉપયોગી થાય છે ? - ઉપગ્રહ, હેમ રેડિયો તથા વેધશાળા
29. આપત્તિ વ્યવસ્થાપન માટે રાજયના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? - મુખ્યપ્રધાન
30. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ છે ? - ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ
31. પરમાણુ આપત્તિના કિસ્સામાં ક્યો વિકલ્પ ન્યુક્લિયર રિએક્ટરોને ઠંડુ કરવો માટે અપનાવી શકાય ? - રીએક્ટરને પાણીનું પમ્પીંગ કરવું, બોરિક એસીડનો ઉપયોગ
32. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? - વડાપ્રધાન
33. ધરતીકંપનો આંચકો આવે, ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હો તો બચવા માટે તાત્કાલિક શું કરશો ? - દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ.
34. તમે આપત્તિને ઓછી કરવાની વાતને કેવી રીતે સમજાવી શકશો ? - આપત્તિને આવતા પહેલા ઓળખવી, તેની અસરને ઓછી કરવાના પ્રયત્નો કરવા અને માનવજીવન અને માલમિલકત પરના આપત્તિના પ્રભાવને મર્યાદિત કરવો.
35. 1956ના ધરતીકંપમાં ક્યું શહેર તારાજ થયું હતું ? - અંજાર
36. જી.એસ.ડી.એમ.એ.નું આખું નામ શું છે ? - ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી
37. ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો. - મિથાઈલ આઈસોસાયનેટ
38. આપત્તિ બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? : જિલ્લા પોલીસ અધિક્ષક
39. કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? : જ્વાળામુખીનું ફાટવું
40. આપત્તિના કારણે થતા નુકસાનની માત્ર ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય ? : આપત્તિ સામેની પૂર્વ તૈયારી
41. વાવાઝોડું જમીનને સ્પર્શે તેને શું કહેવાય છે ? : લેન્ડ ફોલ

17)D, 18)D, 19)B, 20)C, 21)A, 22)B.

કાયદો

કોન્સ્ટેબલ - 23/10/2016

1. ભારતીય ફોજદારી ધારા અંન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?
A) પાંચ B) સાત C) આઠ D) નવ

2. 'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ ક્યા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
A) ગેરકાયદેસર મંડળીના સભ્યો B) બખેડો
C) હુલ્લડ D) બિગાડ (મિસચિફ)

3. 'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.
A) 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોવા ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
B) 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
C) 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
D) 'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

4. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?
A) લોર્ડ માઉન્ટબેટન B) સર ફ્રેડરિક પોલોક
C) લોર્ડ મેકોલે D) લોર્ડ વિલિયમ બેન્ટિક

5. ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા"માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
A) બે B) ત્રણ C) પાંચ D) સાત

6. 'અ', 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેકચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' ક્યા ગુના માટે જવાબદાર ઠરશે ?
A) સાદી ઈજા B) ગંભીર ઈજા
C) ઈરાદાપુર્વકની સાદી ઈજા D) ખુનનો પ્રયત્ન

7. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?
A) 1 થી 489 B) 1 થી 511 C) 1 થી 598 D) 1 થી 623

8. 'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?
A) 299 B) 300 C) 301 D) 302

9. 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેલા નથી. અહીં 'અ' ....
A) ચોરીનાં ગુના માટે જવાબદાર છે.
B) ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
C) મિલ્કતની ગુનાહિત ઉચાપત કરે છે.
D) કોઈ ગુનો કરતો નથી.

10. 'અ', 'બ'ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે ?
A) સાપરાધ મનુષ્ય વધ B) ખૂન
C) બિગાડ D) મિલકતની ગુનાહિત ઉચાપત

11. પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે ?
A) સી.આર.પી.સી. કલમ - 13
B) સી.આર.પી.સી. કલમ - 25
C) સી.આર.પી.સી. કલમ - 125
D) સી.આર.પી.સી. કલમ - 1

12. સી.આર.પી.સી.ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?
A) ત્રણ વર્ષ B) બે વર્ષ C) એક વર્ષ D) પાંચ વર્ષ

13. સી.આર.પી.સી.ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી ક્યા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નૉન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય?
A) એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ B) જિલ્લા પોલીસ અધિક્ષક
C) ડી.વાય.એસ.પી.
D) જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ

14. સી.આર.પી.સી.ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?
A) પંદર દિવસ B) સાત દિવસ
C) એકવીસ દિવસ D) ત્રીસ દિવસ

1)A, 2)B, 3)B, 4)C, 5)A, 6)B, 7)B, 8)D, 9)B, 10)C, 11)C, 12)C, 13)D, 14)D.

15. સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે?
A) આરોપીને ધમકાવવો B) તકસીરવાર ઠરાવવો
C) આરોપીને ગુના અંગેની જાણ કરવી
D) સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

16. "દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?
A) શિલાલેખ B) ધાતુપત્ર
C) મુદ્રિત સામગ્રી D) ઉપરના તમામ (A), (B) અને (C)

17. ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી ક્યા સંજોગોમાં રજૂ કરી શકાય ?
A) જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય
B) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
C) જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય
D) ઉપરના બધા જ સંજોગોમાં (A), (B) અને (C)

18. હકીકત (FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે?
A) કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો
B) કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું
C) કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
D) ઉપરના તમામ (A), (B) અને (C)

19. ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે?
A) પુનઃ તપાસ સમયે B) સર તપાસ સમયે
C) ઉલટ તપાસ સમયે D) સર તપાસ અને પુનઃ તપાસમાં

20. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?
A) ગુનાને નજરે જોનાર
B) ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
C) ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર
D) ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર

21. ભારતના પુરાવાના કાયદાની કલમ - 32 (1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?
A) દિવાની કાર્યવાહીમાં B) ફોજદારી કાર્યવાહીમાં
C) (A) અને (B) બન્નેમાં D) ઉપરમાંથી કોઈનામાં નહીં

22. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?
A) સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
B) સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
C) સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
D) ઉપરના તમામ

કોન્સ્ટેબલ - 2015

23. 'હકીકત' એટલે શું ?
A) ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
B) કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
C) A અને B બંને D) ફક્ત A

24. નીચેનામાંથી ક્યું વાક્ય સાચું છે ?
P) લખાણ એ દસ્તાવેજ છે.
Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.
A) ફક્ત P સાચું છે B) ફક્ત Q સાચું છે.
C) P અને Q કોઈ સાચા નથી D) P અને Q બંને સાચા છે

25. જે હકીકત 'સાબિત થયેલી'ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ?
A) સાબિત થયેલી B) સાબિત ન થયેલી
C) અડધી સાબિત D) ઉપરોક્ત કોઈ નહી

26. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે ?
A) સર તપાસ, ઉલટ તપાસ, ફેરતપાસ
B) સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
C) ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
D) ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ

27. સૂચક પ્રશ્નો અંગે ક્યું વિધાન સાચું છે ?
P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય
A) ફક્ત P સાચુ છે B) ફક્ત Q સાચુ છે
C) P અને Q બંને સાચા છે D) P અને Q બંને ખોટા છે

28. અ એ બ ના ઘરમાંથી ઘરેણાંથી બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ ક્યો ગુનો કર્યો છે ?
A) ચોરી B) લૂંટ C) ધાડ D) છેતરપિંડી

29. સ્વબચાનો હક્ક (રાઈટ ટુ પ્રાઈવેટ ડીફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે?
A) IPC-94 B) IPC-95 C) IPC-96 D) IPC-90

30. ભારતીય ફોજદારી ધારો એટલે
A) ઈન્ડિયન પોલીસ કોડ B) ઈન્ડિયન પ્રોસિજર કોડ
C) ઈન્ડિયન પીનલ કોડ D) ક્રિમીનલ પ્રોસિજર કોડ

31. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
A) ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ
B) લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યક્તિ હોવી જોઈએ
C) ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 4 વ્યક્તિ હોવી જોઈએ
D) ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ

15)C, 16)D, 17)D, 18)D, 19)C, 20)D, 21)C, 22)C, 23)C, 24)D, 25)B, 26)A, 27)C, 28)B, 29)C, 30)C, 31)D.

32. IPC-498 A મુજબ ત્રાસ એટલે

A) પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ

B) ફક્ત શારીરિક ત્રાસ

C) ફક્ત માનસિક ત્રાસ

D) પરણિત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ

33. IPCમુજબ

A) ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી

B) ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે

C) ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહી.

D) ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી

34. ચોરી માટે નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

A) ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે

B) ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે

C) તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે

D) તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે

35. ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ?

A) 2 B) 3 C) 4 D) 5

36. IPC મુજબ

1) કલમ 302-ખૂનની સજા

2) કલમ-307-ખૂનની કોશિશની સજા

3) કલમ-379-ચોરીની સજા

4) કલમ-395- ધાડની સજા

A) ફક્ત 1 સાચું B) 1 અને 2 સાચા

C) 1, 2, 3 સાચા D) 1, 2, 3 અને 4 બધા સાચા

37. ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

A) રૂ.20 B) રૂ.50 C) રૂ.100 D) વિનામૂલ્યે

38. કોગ્નીઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

A) સી.આર.પી.સી. કલમ-141 B) સી.આર.પી.સી. કલમ-145

C) સી.આર.પી.સી. કલમ-151 D) સી.આર.પી.સી. કલમ-155

39. વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે-તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ?

A) 12 કલાક B) 24 કલાક C) 48 કલાક D) 50 કલાક

40. સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

A) સી.આર.પી.સી.કલમ-151 B) સી.આર.પી.સી.કલમ-161

C) સી.આર.પી.સી.કલમ-165 D) સી.આર.પી.સી.કલમ-171

41. મહિલાની ધરપકડ માટે ક્યું વિધાન સાચું છે ?

A) મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે

B) મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી

C) મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહી.

D) મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ.

કોન્સ્ટેબલ - 2012

42. નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

A) પ્રમુખશાહી પધ્ધતિ B) રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંત

C) મૂળભૂત હકકો D) મૂળભૂત ફરજો

43. 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારીત છે?

A) સંસદીય લોકતંત્ર B) સત્તાના વિકેન્દ્રી કરણ

C) પ્રમુખશાહી પધ્ધતિ D) સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા

44. ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

A) 15 ઓગસ્ટ, 1947 B) 26 જાન્યુઆરી, 1947

C) 8 ઓગસ્ટ, 1942 D) 26 જાન્યુઆરી, 1950

45. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે?

A) લોકો દ્વારા સીધી

B) સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા

C) ફક્ત લોકસભાના સભ્યો દ્વારા

D) ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા

46. રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે?

A) રાજ્યસભા B) વિધાનસભા

C) લોકસભા D) વિધાન પરિષદ

47. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે?

A) વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

B) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

C) વિધાનસભાના સ્પીકર D) રાજ્યપાલ

32)A, 33)B, 34)A, 35)D, 36)D, 37)D, 38)C, 39)B, 40)B, 41)D, 42)A, 43)B, 44)D, 45)B, 46)D, 47)D.

48. આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે?

A) આઈ.પી.સી. B) સી.આર.પી.સી.

C) ઈન્ડીયન એવિડન્સ એક્ટ D) ઈન્ડીયન એરેસ્ટ એક્ટ

49. ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે?

A) સી.આર.પી.સી. કલમ 302 B) આઈ.પી.સી. કલમ 302

C) બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 D) ઈન્ડિયન પોલીસ એક્ટ 302

50. લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે?

A) છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ

B) છોકરા છોકરી બન્ને માટે 18 વર્ષ

C) છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20

D) છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ

51. ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે?

A) આઈ.પી.સી. કલમ 154 B) સી.આર.પી.સી. કલમ 154

C) ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154

D) ગુજરાત પોલીસ એક્ટ કલમ 154

52. ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ?

A) 4 B) 5 C) 6 D) 7

53. કરફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે?

A) આઈ.પી.સી. કલમ 144 B) સી.આર.પી.સી. કલમ 144

C) ગુજરાત પોલિસ એક્ટ કલમ 144

D) ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 144

54. સી.આર.પી.સી.નું આખું રૂપ શું છે ?

A) ક્રિમિનલ રીસ્પેક્ટ એક્ટ પ્રોટેક્શન કોડ

B) ક્રિમિનલ રાઈટસ પ્રોટેકશન કોડ

C) ક્રિમિનલ પ્રોસિજર કોડ D) કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ

55. માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે?

A) 7 B) 14 C) 21 D) 30

56. સ્ત્રીને સાસરીયાં દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે?

A) ઈ.પી.કો.ક. 498 B) ઈ.પી.કો.ક. 498 (A)

C) ઈ.પી.કો.ક. 489 D) ઈ.પી.કો.ક. 489 (A)

57. ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે?

A) બિગાડ B) ઠગાઈ C) વિશ્વાસઘાત D) બદનક્ષી

ASI કાયદો - 3/5/2015

58. ઈન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?

A) 491 B) 526 C) 511 D) 503

59. ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ?

A) કલમ 126થી 130 B) કલમ 228થી 235

C) કલમ 131 થી 140 D) કલમ 148 થી 152

60. ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

A) 318 B) 405 C) 415 D) 426

61. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ?

A) જિલ્લા મેજિસ્ટ્રેટ B) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ

C) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ D) ઉપરના બધા

62. બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

A) 304 A B) 397 A C) 308 A D) 310 A

63. નીચેનામાંથી ક્યુ કૃત્ય ઈન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

A) કોઈ સ્ત્રીએ કરેલ ગુનો

B) કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો

C) અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય

D) ઉપરના તમામ

64. ઈન્ડીયન પીનલ કોડની કલમ 306માં ક્યા ગુનાની સજા દર્શાવેલ છે ?

A) ગુનાહિત મનુષ્યવધની કોશિષ B) ખૂન કરવાની કોશિષ

C) આપઘાતની કોશિષ D) આપઘાતનું દુષ્પ્રેરણ

65. ઈન્ડીયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?

A) 10 વર્ષ B) 7 વર્ષ C) 5 વર્ષ D) 12 વર્ષ

66. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ?

A) 145 B) 120 C) 141 D) 100

67. નીચેના પૈકી ક્યું સ્વરૂપ ધારણ કરવું એ ઈન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

A) જાહેર નોકરનું સ્વરૂપ B) રબારીનો વેશ ધારણ કરવો

C) સૈનિકનું સ્વરૂપ

D) ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો

48)B, 49)B, 50)D, 51)B, 52)B, 53)B, 54)C, 55)D, 56)B, 57)B, 58)C, 59)C, 60)B, 61)D, 62)A, 63)C, 64)D, 65)B, 66)C, 67)B.

68. ઈન્ડીયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે?

A) 32 B) 48 C) 40 D) 72

69. ઈન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?

A) 301 B) 300 C) 299 D) 302

70. નીચેનામાંથી કઈ પદ્ધતિ ઈન્ડીયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ?

A) કાવતરુ રચીને B) હથિયારો આપીને

C) ઉશ્કેરણીથી D) આપેલ તમામ

71. નીચેના પૈકી ઈન્ડીયન પીનલ કોડમાં ક્યા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ?

A) બળાત્કાર-371 B) ઠગાઈ-415 C) ધાડ-391 D) ચોરી-379

72. નીચેના પૈકી ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે ?

A) 509 B) 32 C) 214 D) 352

73. ઈન્ડીયન પીનલ કોડના ક્યા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?

A) 18 B) 17 C) 16 D) 19

74. નીચેનામાંથી ક્રિમીનલ પ્રોસીજર કોડમાં તપાસ કોન કરી શકે છે?

A) પોલીસ અધિકારી B) મેજિસ્ટ્રેટ

C) મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ

D) ઉપરના તમામ

75. ક્રિમીનલ પ્રોસીજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

A) ઘર B) તંબુ

C) જહાજ D) ઉપરના તમામ

76. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?

A) 10 વર્ષ B) 7 વર્ષ C) 3 વર્ષ D) 5 વર્ષ

77. પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ?

A) 61 B) 51 C) 41 D) 71

78. કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

A) 28 કલાક B) 24 કલાક C) 18 કલાક D) 48 કલાક

79. ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?

A) 75 B) 100 C) 90 D) 60

80. અગ્રહણીય ગુનો એટલે શું ?

A) એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી

B) એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે

C) એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય

D) ઉપરમાંથી એકેય નહી

81. ક્રિમીનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ?

A) 44 B) 43 C) 43 D) 46

82. ક્રિમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવમાં આવે છે ?

A) 124 B) 130 C) 125 D) 123

83. FIRનું પૂરું નામ શું છે ?

A) first information record B) First Information Report

C) First Investigation Report D) first Investigation Record

84. આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?

A) 176 B) 175 C) 174 D) 173

85. ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ?

A) 301 B) 309 C) 304 D) 305

86. ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ?

A) 319 B) 320 C) 325 D) 317

87. ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?

A) ધરપકડનું કારણ

B) નિર્દોષ જાહેર થવાનો ઉપાય

C) અપરાધથી બચવાનો ઉપાય

D) કસ્ટડીમાંથી બહાર નિકળવાનો ઉપાય

88. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?

A) મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ B) સેશન્સ જજ

C) જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ D) એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

89. ભાતરીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ? - **પાંચ**

68)C, 69)B, 70)D, 71)A, 72)A, 73)B, 74)D, 75)D, 76)C, 77)C, 78)B, 79)C, 80)A, 81)C, 82)C, 83)B, 84)C, 85)C, 86)B, 87)A, 88)D.

90. 'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ ક્યા ગુના માટે જવાબદાર ઠરી શકે ? - **બખેડો**

91. 'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. - **'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.**

92. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? - **લોર્ડ મેકોલે**

93. ભારતીય ફોજદારી ધારા અન્વયે ''ગુનાહિત કાવત્રા''માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? - **બે**

94. 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' ક્યા ગુના માટે જવાબદાર ઠરશે ? - **ગંભીર ઈજા**

95. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? - **1 થી 511**

96. 'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? - **302**

97. 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેલા નથી. અહીં 'અ' ....- **ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.**

98. 'અ', 'બ'ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે ? - **બગાડ**

99. પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે ? - **સી.આર.પી.સી. કલમ - 125**

100. સી.આર.પી.સી.ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? - **એક વર્ષ**

101. સી.આર.પી.સી.ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી ક્યા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? - **જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ કલાસ**

102. સી.આર.પી.સી.ના પ્રબંધો અનુસાર, 'ફરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? - **ત્રીસ દિવસ**

103. સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે? - **આરોપીને ગુના અંગેની જાણ કરવી**

104. ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? - **ઉલટ તપાસ સમયે**

105. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? - **ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર**

106. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? - **સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ**

107. જે હકીકત 'સાબિત થયેલી'ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ? - **સાબિત ન થયેલી**

108. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે ? - **સર તપાસ, ઉલટ તપાસ, ફેરતપાસ**

109. અ એ બ ના ઘરમાંથી ઘરેણાથી બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ ક્યો ગુનો કર્યો છે ? - **લૂંટ**

110. સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઈવેટ ડીફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ? - **IPC-96**

111. ભારતીય ફોજદારી ધારો એટલે - **ઈન્ડિયન પીનલ કોડ**

112. IPC-498ક મુજબ ત્રાસ એટલે - **પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ**

113. IPCમુજબ - **ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે**

114. ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? - **5**

115. ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? - **વિનામૂલ્યે**

116. કોગ્નીઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? - **સી.આર.પી.સી. કલમ-151**

117. વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે-તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ? - **24 કલાક**

118. સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? - **સી.આર.પી.સી.કલમ-161**

119. ગુજરાત પોલીસના મુદ્રાલેખ સંબંધમાં સાચુ વિધાન ક્યું છે ? - **સેવા, સુરક્ષા, શાંતિ**

120. પોલીસ તપાસ અંગેનો આખરી તબક્કો ચાર્જશીટ સામાન્યતઃ કેટલા દિવસમાં કરવો જોઈએ ? - **60**

121. ક્યા ઈસમો વિરુદ્ધ 'એ' રોલ ભરવામાં આવે છે ? - **હિસ્ટ્રીશીટર**

122. 'અ' વર્ગના ગામડાની વિઝીટ, બીટ હેડ કોન્સ્ટેબલ એક માસમાં કેટલી વખત કરવાની હોય છે ? - **એક વખત**

123. ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમ મુજબ પ્રથમ બાતમી અહેવાલ ફક્ત કોગ્નીઝેબલ ગુનાના સંદર્ભમાં નોંધી શકાય છે? **- કલમ-154**

124. પોલીસ કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના કારણની મેજિસ્ટ્રેટ મારફત તપાસ કરવાની જોગવાઈ ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમમાં કરવામાં આવી છે? **- કલમ-176**

125. ક્રિમિનલ પ્રોસીજર કોડ-1973ની જોગવાઈઓ અનુસાર ઝડતીનું વોરંટ કોણ કાઢી શકે? **- કોઈપણ ન્યાયાલય**

126. એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? **- રાજ્ય સરકાર**

127. અપવાદરૂપ સંજોગો સિવાય કોઈપણ સ્ત્રીની ધરપકડ સૂર્યાસ્ત બાદ તથા સૂર્યોદય પહેલાં કરી શકાશે નહી. આ કલમ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ક્યા વર્ષથી ઉમેરવામાં આવી છે? **- વર્ષ 2005**

128. સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે ક્યા રજૂ કરવામાં આવે છે? **- વડી અદાલત સમક્ષ**

129. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય? **- પ્રથમ માહિતી રિપોર્ટ**

130. ભારતીય ફોજદારી ધારા-1860નો અમલ કઈ તારીખથી થયો હતો? **- 1 જાન્યુઆરી, 1862**

131. કલમ-147 (ભારતીય ફોજદારી ધારા)માં ક્યા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે? **- હુલ્લડ માટેની**

132. ભારતીય ફોજદારી ધારામાં 'સાપરાધ મનુષ્યવધ જે ખૂન ગણાય' તે માટેના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં જણાવેલ છે? **- કલમ-302**

133. પાંચ અથવા તેથી વધુ વ્યક્તિઓની મંડળી દ્વારા તે મંડળીના સામાન્ય ઉદ્દેશ્યને પાર પાડવા માટે કરવામાં આવેલી હિંસા કયો ગુનો બને છે? **- હુલ્લડ**

134. નિતેશે પોતાના એક પત્રમાં બિહાર સરકાર વિરુદ્ધ ધિક્કાર અને નફરત તથા તિરસ્કાર ઉત્પન્ન કર્યા. તો તે નીચેનામાંથી ક્યા ગુના માટે જવાબદાર છે? **- રાજદ્રોહ માટેના**

135. ભારતના ફોજદારી અધિનિયમ-1860ની જોગવાઈઓ અનુસાર કોઈ અન્ય વ્યક્તિનું પ્રવેશપત્ર મેળવીને પરીક્ષામાં બેસવું અને તેના નામ પર દસ્તાવેજ હસ્તાંતરિત કરવો એ. **દગાબાજી યુક્ત ઠગાઈ અને કપટ**

136. કાયદા વિરુદ્ધની મંડળીને જ્યારે વિખેરાઈ જવા આદેશ આપવામાં આવેલ હોય અને જો મંડળીના સભ્યો મંડળીમાં જોડાઈ રહે તો તેમને ગુનો સાબિત થયેથી કેટલા વર્ષની સજાની ભારતીય ફોજદારી ધારામાં જોગવાઈ કરાયેલ છે? **- બે વર્ષ સુધીની**

137. નિષ્ણાતનો પુરાવો ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત.....**- નિર્ણાયક સાબિતી ગણાય નહી**

138. ચારિત્ર અંગેના સાહેદોની તપાસ નીચેની કઈ રીતે થઈ શકશે? **- ઉલટતપાસ અને ફેરતપાસ**

139. ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે મૂંગો સાક્ષી....**- સક્ષમ સાક્ષી છે**

140. ભારતનો પુરાવા અધિનિયમ, 1872ની જોગવાઈઓ અનુસાર બોલાવનારા પક્ષને પોતાના સાક્ષીથી સૂચક પ્રશ્ન પૂછવાની પરવાનગી ક્યારે આપી શકાય છે? **- ઉલટ તપાસમાં**

141. પુરાવાના અધિનિયમ અન્વયે જ્યાં કોઈ દસ્તાવેજ કેટલીક મૂળ પ્રતિઓમાંથી બનાવેલ હોય. ત્યાં નીચે પૈકી ક્યા પ્રાથમિક પુરાવો હશે? **- બધી જ મૂળ પ્રતિ**

142. ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ ન્યાયાલયના નિરીક્ષણ માટે રજૂ કરેલ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ ક્યા પ્રકારનો પુરાવો ગણાય? **- દસ્તાવેજી પુરાવો છે**

143. ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ? **- પ્રત્યક્ષ**

144. ભારતના પુરાવાના અધિનિયમની કલમ-53માં શું જણાવેલ છે?**- ફોજદારી કાર્યવાહીમાં વ્યક્તિ સારા ચારિત્ર્યવાળી છે તે હકીકત પ્રસ્તુત છે.**

145. ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ સમલૈંગિક્તા ઉપર પ્રતિબંધ છે?**- 377**

146. કોગ્નીઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી :**- વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.**

147. પોલીસ અધિકારીએ ધરપકડ કરેલ વ્યક્તિને, ક્ષેત્રાધિકાર મેજીસ્ટ્રેટની સામે કોર્ટમાં હાજર કર્યા વગર તેની હિરાસતમાં અધિકતમ કેટલા સમય માટે રાખી શકાય છે?**- 24 કલાક**

148. પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાખે છે પણ ખિસ્સુ ખાલી હોય છે. X :**- ચોરીના પ્રયાસ માટે દોષી છે.**

149. મહિલાની મરજીથી, પુરુષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ, બળાત્કારનો કેસ ગણવામાં આવશે જો મહિલાની ઉંમર ......થી ઓછી હોય.**- 18 વર્ષ**

150. B ના ઘરમાં A બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે.તે........ ગુનો કરે છે.**- ઘરફોડી**

151. ભારતીય દંડ સંહિતા કલમ 141 ની જોગવાઈ મુજબ, ગેરકાયદેસર મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? **5 વ્યક્તિઓ**

152. ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 420 માં ક્યા ગુનાની સજાની જોગવાઈ છે?**- છેતરપિંડી**

153. ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 18 મુજબ 'ભારત' એટલે: **- જમ્મુ અને કશ્મીર રાજ્ય સિવાયનું ભારતનું ક્ષેત્ર**

154. જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ..... સમય માટે નીમી શકે છે. - **6 મહિના**

155. નાગરિકોના મૂળભૂત હક્કના અમલ માટે કોર્ટ, નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે ?- રિટ

156. સંસદમાં શૂન્યકાળ એટલે શું ? - **અતિમહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે આપવામાં આવતો સમય**

157. ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કોને લાગૂ પડે છે ? - **ન્યાયિક કોર્ટ સમક્ષ કાર્યવાહીને**

158. ગ્રામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ?- **પોલીસ અધિક્ષક**

159. 2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેમને રોકતા, A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે. તે કયો ગુનો કરે છે ? - **લૂંટ**

160. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973 ની ધારા 144 આધીન પસાર કરવામાં આવેલ હુકમ :- **વહીવટી પ્રકારનો છે.**

161. સામાન્ય રીતે કોઈ ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને રીમાન્ડ પર પોલીસ હિરાસતમાં અધિકતમ.... દિવસ રાખી શકાય છે ? - **15**

162. ભારતીય દંડ સહિતાના ક્યા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે ? - **16**

163. ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવુ છે જેમાં એક માત્ર કલમ છે. તે કલમ કઈ છે ? - **498 (A)**

164. ભારતીય દંડ સંહિતાના ક્યા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ? - **2**

165. ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ :- **ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.**

166. જો કોઈ બાળક ગુનો કરે, તો ભારતીય દંડ સંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ? - **7 વર્ષ**

167. ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ ડાઈંગ ડીક્લેરેશન બાબતે છે ? - **32**

168. કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો ? - **1 સપ્ટેમ્બર 1872**

169. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે ? - **484**

170. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની પ્રકરણ કલમ કઈ છે ?- **37**

171. પોલીસની તપાસ પશ્ચાત ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત કોર્ટમાં મોકલવામાં આવે છે ? - **173**

172. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરન્ટ વગર ધરપકડ કરી શકે છે ? - **41**

173. ઈન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? - **511**

174. ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? - **કલમ 131 થી 140**

175. ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ? - **405**

176. બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? - **304 A**

177. ઈન્ડીયન પીનલ કોડની કલમ 306માં ક્યા ગુનાની સજા દર્શાવેલ છે ? - **આપઘાતનું દુષ્પ્રેરણ**

178. ઈન્ડીયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ? - **7 વર્ષ**

179. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? - **141**

180. ઈન્ડીયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? - **40**

181. ઈન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? - **300**

182. ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે ? - **509**

183. ઈન્ડીયન પીનલ કોડના ક્યા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? - **17**

184. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ? - **3 વર્ષ**

185. પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? - **41**

186. કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? - **24 કલાક**

187. ક્રિમીનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે?- **14 દિવસ**

188. ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? - **90**

189. અગ્રાહ્ય ગુનો એટલે શું ? - **એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી**

190. ક્રિમીનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? - **43**

191. ક્રિમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?- **125**

192. FIRનું પૂરું નામ શું છે ? - **First Information Report**

193. આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ? - 174

194. ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ? - 304

195. ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપેલ છે ? - 320

196. ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? - **ધરપકડનું કારણ**

197. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? - **એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ**

198. ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય ? - **ત્રણ વર્ષ**

199. ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ જો અન્વેષણ ચોવીસ કલાકમાં પૂરું થઈ શકે તેમ ન હોય તો કલમ 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે ?- **રિમાન્ડની**

200. ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને ક્યારે રાજ્યના ખર્ચે વકીલ પૂરો પાડે છે ? - **આરોપી પાસે નાણાં ન હોય**

201. ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે ? - **કલમ-154**

202. પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડના ક્યા પ્રકરણમાં કરવામાં આવે છે ? - **પ્રકરણ-12**

203. બિન વારસી મળેલ મિલકતને ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય ? - **102**

204. ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે ? - **306**

205. અપીલનો અધિકાર એ.........અધિકાર છે.- **કાનૂની**

206. ભારતીય એવીડન્સ એક્ટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? - **27**

207. ભારતીય એવીડન્સ એક્ટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે ક્યા પ્રકારની ગણાય ? - **અમાન્ય ગણાય**

208. ભારતીય એવીડન્સ એક્ટની કઈ કલમમાં ગૌણ પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી ? - **કલમ-65**

209. ભારતીય એવીડન્સ એક્ટની કઈ કલમમાં ઓળખ પરેડ અંગેની જોગવાઈ ?- **કલમ-9**

210. ભારતીય એવીડન્સ એક્ટના કાયદાની જોગવાઈ મુજબ ચોરી થયેલો માલ જેના કબજામાં રહેલો હોય તે શું ગણાય ? - **પુરાવો**

211. ઉલટ તપાસ સામાન્ય રીતે ક્યા પક્ષ દ્વારા થાય છે ? - **વિરોધ પક્ષ દ્વારા**

212. ભારતીય એવીડન્સ એક્ટ પ્રમાણે ક્યા શબ્દમાં તમામ ન્યાયાધિશોને અને મેજિસ્ટ્રેટોનો અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે ?- **ન્યાયાલય**

213. ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ નીચેનામાંથી કઈ બાબત ઈલેક્ટ્રોનિક સાક્ષી પુરાવો ગણાય છે ? - **ડિઝિટલ સિગ્નેચર**

214. ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે ? - **કલમ-32**

215. કોઈપણ સાક્ષીની સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે ? - **સર તપાસ**

216. ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ છે ? - **186**

217. ઈન્ડીયન પીનલ કોડમાં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારેમાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ? - **10 વર્ષ**

218. ઈન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઈ કલમ પોલીસ અધિકાર બહારની છે ? - **323**

219. ગેરકાયદેસર મંડળી માટે ઈન્ડીયન પીનલ કોડની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ ? - **5**

220. સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઈન્ડીયન પીનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે ? - **498-ક**

221. કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ? - **12 નોટીકલ માઈલ**

222. કેટલા મૃત્યુ નીપજાવવની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? - **506-2**

223. જ્યારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ?- **507**

224. ઈન્ડીયન પીનલ કોડ નીચેનામાં ક્યા રાજ્યને લાગુ પડતું નથી? - **જમ્મુ અને કાશ્મીર**

225. ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે?- **201**

226. સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે?- **188**

227. જ્યારે કોઈ વ્યકિત પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યકિતને મારે છે તે બાબતનો ઈન્ડીયન પીનલ કોડની કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે. - **4**

228. લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે? - **લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે.**

229. ઈન્ડીયન પીનલ કોડ મુજબ કોઈ વ્યકિત 15 વર્ષની છોકરી સાથે તેની સંમતીથી સંભોગ કરે તો કયો ગુનો બને છે.- **બલાત્કારનો ગુનો લાગુ પડે**

230. ચલણી નોટોના ગુનાઓ ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ બને છે.- **489 (ક)**

231. જ્યારે કોઈ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે ઈન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે. - **ગુનો બનતો નથી**

232. ઈન્ડીયન પીનલ કોડ પ્રમાણે કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે? - **એક સરખો ઈરાદો**

233. કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય? - **20 દિવસ**

234. ઈન્ડીયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યકિતને અધિકાર છે?- **મિલ્કત અને શરીર**

235. બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ ક્યારે થઈ શકે? - **ભોગ બનનાર મહિલાની સહમતીથી**

236. ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં કરવામાં આવેલ છે? - **506**

237. ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? - **7 વર્ષ**

238. પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ થાય છે? - **24**

239. જ્યારે કોઈ વ્યકિત પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યકિતને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે.- **41 (1)(d)**

240. એકસીક્યુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરે શકે? - **રાજ્ય સરકાર**

241. વોરંટ કેસ એટલે ? - **ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો**

242. સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે? - **હાઈકોર્ટ**

243. પબ્લિક પ્રોસીક્યુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે? - **ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટ**

244. ક્રીમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ પોલીસ અધિકારીને અન્વેષણ પરથી કોઈ આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા ન મળે તો તેને કસ્ટડીમાંથી મુકત કરવાની જોગવાઈ છે.- **169**

245. ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે? - **અન્વેષણ પુરૂ થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ**

246. ભારતીય એવીડન્સ એકટની કલમમાં 'સાંભળેલ પુરાવા' અંગેની જોગવાઈ છે? - **60**

247. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે? - **હાઈકોર્ટને**

248. ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન ક્યારે પ્રસ્તુત ગણાય જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે? - **32**

249. ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતુ નથી? - **નિવેદન કરવાનો ક્ષમતાનો અભાવ**

250. આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબુલાત ક્યારે માન્ય ગણાય છે? - **મેજીસ્ટ્રેટ સમક્ષ કબુલાત કરી હોવી જોઈએ**

251. રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે? - **મુખ્યમંત્રીશ્રી**

252. ભારતીય એવીડન્સ એકટની કલમ 74માં શેની જોગવાઈ છે? - **જાહેર દસ્તાવેજ**

253. ભારતીય એવીડન્સ એકટની કઈ કલમ હેઠળ થયેલ કબુલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે? - **27**

254. કયા વર્ષમાં 'દહેજ હત્યા ધૃષ્ટતા' તરીકે ભારતીય એવીડન્સ એકટના કાયદામાં કલમ 113(બી) શામેલ કરવામાં આવી? - **1986**

255. ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઈલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી? - **વર્ષ-2000**

256. રાજ્ય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષપદે કોણ છે? - **ડારેકટર જનરલ ઓફ પોલીસ**

257. આઈ.એમ.એફ.એલ. એટલે શું? - **ભારતમાં બનેલી વિદેશી દારૂ**

258. પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે? - **લોકરક્ષક**

259. આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘડાયેલ (TADA)ના કાયદાનું પૂરું નામ જણાવો. - **Terrorist and Disruptive Activities (Prevention) Act**

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર

PSI GK - 1/1/2017

1. **સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા રાષ્ટ્રના હતા ?**
A) ઓસ્ટ્રીયા B) ઓસ્ટ્રેલિયા C) સ્પેઈન D) ફ્રાન્સ

2. **નીચેનમાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?**
A) મેક્સવેબર B) એમ.એન.શ્રીનિવાસ
C) એમીલ દર્ખીમ D) એન્દ્રે બેતે

3. **સુપસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં ક્યા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?**
A) કૂતરો B) ઉંદર C) ઘોડો D) ઘેટું

4. **નીચેનામાંથી ક્યા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?**
A) કેરોલીન મે B) સ્ટીફન જોન્સ
C) મેક્સ વેબર D) મ્યુલર ક્રિશ્ચયન

5. **નીચેનમાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?**
A) એમ.એન.શ્રીનિવાસ B) યોગેન્દ્રસિંહ
C) ઈરાવતી કર્વે D) વિશ્વનાથ મોહન

6. **નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?**
A) અમિત અબ્રાહમ B) જી.ડી.બોઆઝ
C) ગોવિંદરાજ પદ્મનાભન D) નરેન્દ્રનાથ સેનગુપ્તા

7. **..........ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ?**
A) ઓગસ્ત કોન્ત B) એમ.પી.પોલેટ
C) એમીલ દર્ખીમ D) પ્લૂટો

8. **'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?**
A) ઓગસ્ટ કોંત B) કાર્લ માકર્સ
C) એમ.એન.રોય D) બી.એફ્રી સ્કીનર

9. **ભારતીય મનો વિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :**
A) 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો
B) 1918માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો
C) 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો
D) 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો

કોન્સ્ટેબલ - 23/10/2016

10. **મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે?**
A) સમાજલક્ષી B) વિકાસાત્મક
C) મનોમાપનલક્ષી D) પર્યાવરણલક્ષી

11. **કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય?**
A) નિર્જીવ B) અનુવંશ C) સજીવ D) વારસો

12. **કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે?**
A) આપખુદ B) અધિકારવાદી
C) લાડ લડાવવાની D) સામેલગીરી વિનાની

સામાજિક અધિકારી - 25/2/2017

13. **સ્વરૂપ ભેદની દષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં......... જોવા મળતું નથી ?**
A) વર્ગ સ્તરીકરણ B) જ્ઞાતિ સ્તરકરણ
C) લિંગ સ્તરીકરણ D) ભાષા સ્તરીકરણ

14. **ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?**
A) ડૉ. રાધાકમલ મુકરજી B) એમ.હેરોલોમ્બીસ
C) મેકઆઈવર અને પેજ D) રોબર્ટ મર્ટન

15. **નીચેનામાંથી કયુ સામાજિક ધોરણનું લક્ષણ નથી ?**
A) સંસ્થાકરણ B) વર્તનનો માપદંડ
C) સામાજીકરણ D) સમૂહ દ્વારા સર્જન

16. **સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને............. કહેવાય છે.**
A) સામાજિક પ્રક્રિયા B) સામાજિક વ્યવસ્થા
C) સામાજિક નિયંત્રણ D) સામાજિક ધોરણ

17. **કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે?**
A) યંગ અને મેક B) ગિન્સબર્ગ
C) જહોન્સન D) મેકાઈવર અને પેજ

18. **..........એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી.**
A) લિંગ B) વય C) રક્તસંબંધો D) કુશળતા

19. **વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ....પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ?**
A) અર્પિત દરજ્જો B) પ્રાપ્ત દરજ્જો
C) ગ્રાહ્ય દરજ્જો D) વૈકલ્પિક દરજ્જો

20. **કલ્યાણ રાજ્ય ક્યા સિદ્ધાંત પર આધારિત છે ?**
A) તકની સમાનતા B) સંપત્તિની સમાન વહેંચણી
C) સશક્તોની જાહેર જવાબદારી D) જાતિવાદી કલ્યાણ

21. **કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો ક્યા છે ?**
A) સામાજિક વીમો B) સામાજિક સેવાઓ
C) ગરીબી નિવારણ કાર્યક્રમ D) ઉપરના તમામ

1)A, 2)C, 3)A, 4)C, 5)D, 6)C, 7)A, 8)B, 9)A, 10)A, 11)C, 12)C, 13)D, 14)D, 15)C, 16)C, 17)B, 18)D, 19)A, 20)D, 21)D.

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

22. ....ની પ્રેરણાને પરિણામે જ કુટુંબ અને સમાજો રચાયા છે. - **સંલગ્નતા**
23. સિદ્ધિની પ્રેરણા........ના ધોરણો અપનાવવા પ્રેરે છે. - **ઉત્તમતા**
24. અપેક્ષિત કે ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે.........આવેગ ઉદ્‌ભવે છે. - **હતાશા**
25. સહભાગી નિરીક્ષણ પદ્ધતિને મુખ્યત્વે ક્યા સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ છે ? - **સામાજિક માનવશાસ્ત્ર**
26. પૂર્વ અનુભવ કે મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ અને કાયમી ફેરફાર એટલે... - **શિક્ષણ**
27. 'ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચય' પુસ્તકના લેખક કોણ છે ? - **ડૉ.અક્ષયકુમાર દેસાઈ**
28. શાસ્ત્રીય અભિસંધાનના શિક્ષણના પ્રથમ શોધક......હતા. - **પાવલોવ**
29. સાક્ષરતાના વ્યાપને જાણવા માટે શું ઉપયોગી બની રહે છે ? - **ટકા**
30. ....એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. - **સ્મૃતિ**
31. ભારતના સમાજશાસ્ત્રના પિતા કોણ છે ? - **ડૉ.ઘૂર્યે**
32. 90-109 સુધીના બુદ્ધિઆંકને........ગણવામાં આવે છે. - **સામાન્ય**
33. ....એ શરીરના બાંધાને આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા છે. - **ક્રેશ્મર અને શેલ્ડન**
34. 'દ્રાક્ષ ખાટી છે' જેવા ખોટા ઉપજાવી કાઢેલા કારણો આપવાની કે બહાના કાઢવાની પ્રયુક્તિને ....ની બચાવ પ્રયુક્તિ કહેવાય છે. - **યૌક્તિકીકરણ**
35. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો ? - **લીંડમેન**
36. ઉપલા વર્ણનો પુરુષ નિમ્ન વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તો તેને શું કહેવાય ? - **અનુલોમ લગ્ન**
37. પૂર્વગ્રહ જ્યારે બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય છે, ત્યારે તેને.......કહેવાય છે. - **ભેદભાવ**
38. મનોભાર માટેનો અંગ્રેજી શબ્દ 'Stress'.......શાખાનો શબ્દ છે. - **ઈજનેરી**
39. સલાહ પ્રક્રિયામાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચે...... સ્થપાય તે અનિવાર્ય છે. - **સાયુજ્ય**
40. સલાહનો અસીલ કેન્દ્રીત અભિગમ.......એ આપ્યો છે. - **કાર્લ રોજર્સ**
41. સામાજિક શિક્ષણનો સિદ્ધાંત.........એ આપ્યો છે. - **બાંડુરા**
42. સમાજશાસ્ત્રમાં 'ફોક્સ ગ્રૂપ ડિસ્કશન' (FGD)નો ઉપયોગ ક્યા સમાજશાસ્ત્રીએ સૌપ્રથમ કર્યો ? - **રોબર્ટ મર્ટન**
43. વર્તનવાદનો સિદ્ધાંત..........એ આપ્યો હતો. - **વોટ્સન**
44. બાળ મનોવિજ્ઞાન અનુસાર બાલ્યકાળ...... વર્ષ સુધીનો હોય છે. - **0-12**
45. એમ. એન. શ્રીનિવાસે 'સંસ્કૃતિકરણ'ના ખ્યાલ પૂર્વે ક્યો ખ્યાલ આપ્યો હતો ? - **બ્રાહ્મણીકરણ**
46. 20મી સદીને મનોવૈજ્ઞાનિકો.........ના યુગ તરીકે ઓળખાવે છે. - **ચિંતા**
47. જીવનમાં આવતી સમસ્યાઓને પહોંચી વળવામાં વ્યક્તિ......... અનુભવે છે. - **તનાવ**
48. 'અધિશેષ મૂલ્ય'નો ખ્યાલ કોણે આપ્યો ? - **કાર્લ માર્ક્સ**
49. ધર્મો અંગેનો તુલનાત્મક અભ્યાસ કોણે કર્યો ? - **મેક્સ વેબર**
50. મનોભાર એટલે વ્યક્તિના........ને ખલેલ પહોંચાડનારી ઘટના કે પરિસ્થિતિ. - **સંતુલન**
51. 'ધર્મ પરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? - **અર્જિત દરજ્જો**
52. ....એ વ્યક્તિત્વના 16 મૂળ ગુણ શોધ્યા છે. - **રેમન્ડ કેટલ**
53. ....ના મતે વ્યક્તિત્વના ત્રણ વિભાગો છે. - **ફ્રોઈડ**
54. સંસ્કૃતિકરણના ખ્યાલને સમકક્ષ ખ્યાલ ક્યો છે ? - **સંદર્ભ જૂથ**
55. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા......ની લાઈપઝિંગ યુનિવર્સિટીમાં શરૂ કરાઈ હતી. - **જર્મની**
56. પ્રયોગમાં ....પ્રકારના પરિવર્ત્યો ધ્યાનમાં લેવાય છે. - **ત્રણ**
57. ફ્રાન્સમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના 1905માં ......એ કરી હતી. - **બીને સાયમન**
58. ....એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર. - **વૃદ્ધિ**
59. ધ્યાન એટલે.........ના અર્થઘટન વડે જ્ઞાન પામવાની ક્રિયા. - **સંવેદન**
60. જ્યારે કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે તો એ સ્થિતિને કેવા પ્રકારની ગતિશીલતા કહેવાય ? - **નિમ્નગામી**
61. ....એટલે પસંદગી કરેલ ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવાની ક્રિયા. - **ધ્યાન**
62. ....ના પ્રણેતા સિગ્મન્ડ ફ્રોઈડ હતા. - **મનોવિશ્લેષણવાદ**
63. ....મનોરોગોના નિદાન અને સારવારનું કામ કરે છે. - **ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો**
64. ભારતમાં સમાજકાર્ય શિક્ષણની શરૂઆત ક્યા વર્ષથી થઈ ? - **1936**

ગુજરાતી વ્યાકરણ

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. સાચી જોડણી શોધો.
   A) સુનમૂન B) સૂનમૂન C) સુનમુન D) ષૂનમુન
2. ખોટી જોડણી શોધો.
   A) પરિચારિકા B) પરિચિત C) વીજળી D) હોશીયાર
3. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.
   લેખુ
   A) હિસાબ B) લખવું C) લાખ D) લડવું
4. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
   ઓછું આવવું.
   A) વધારે ન હોવું B) ખૂશ થવું
   C) દુઃખ થવું D) કરકસર કરવી
5. સંધિ છોડો.
   ખિન્ન
   A) ખિદ્ + ન B) ખિદ + ન C) ખિન્ + ન D) ખિદ + ન્
6. સંધિ જોડો.
   સ + અંગ + ઉપ + અંગ
   A) સંગોપાગ B) સાંગોપાંગ
   C) સગોંપાંગ D) સાંગાઉપાંગ
7. વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય -
   A) અવલી B) કવલી C) સાવલી D) ઝાવલી
8. નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.
   A) આત્મરક્ષણ B) સંબંધિત C) અટકાવ D) કવચ
9. આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.
   ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.
   A) ને B) થી C) નો D) ની
10. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
    નરસિંહ
    A) તત્પુરુષ B) ઉપપદ C) કર્મધારય D) દ્વન્દ્વ
11. અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.
    મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.
    A) વર્ણસગાઈ B) ઉપમા C) વ્યાજસ્તુતિ D) વ્યતિરેક
12. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
    દૂઝણી ગાયની લાત પણ સારી
    A) જાહેર ચીજ સૌના માટે હોય છે
    B) દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
    C) ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
    D) દૂઝણી ગાય દૂધ આપતી નથી
13. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
    ઉદધિ
    A) સરિતા B) માખણ C) આપગા D) અબ્ધિ
14. નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
    છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.
    A) છાયા ગંધર્વને પ્રેમ કરે છે. B) છાયા ગંધર્વને પ્રેમ કરશે.
    C) છાયા ગંધર્વના પ્રેમમાં પડી. D) શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી.
15. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
    કુંવર રડી પડી.
    A) કુંવર રડી પડશે B) કુંવરથી રડી પડાયું.
    C) કુંવરથી રડી પડાય છે. D) કુંવર રડશે નહીં.
16. નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
    તે ખાય છે.
    A) તેનાથી ખવાય છે B) તેની પાસે ખવાશે
    C) તેને ખવડાવે છે D) તેને ખવડાવશે
17. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
    કિશા <u>લખતાં-લખતાં</u> ટીવી જુએ છે.
    A) ભૂતકૃદંત B) વર્તમાન કૃદંત
    C) ભવિષ્યકૃદંત D) વિધ્યર્થકૃદંત
18. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.
    ભાઠો
    A) પથરો B) ભાલ C) દલાલી D) કલેડું
19. નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
    A) કુરંગ B) સારંગ C) નીલકંઠ D) મૃગ
20. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
    આબરૂ
    A) તત્પુરુષ B) મધ્યમપદલોપી
    C) બહુવ્રીહિ D) અવ્યયીભાવ
21. શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.
    A) અતોલ, અતીવ, અતિચાર, અતલસ
    B) અતલસ, અતિચાર, અતીવ, અતોલ
    C) અતીવ, અતોલ, અતલસ, અતિચાર
    D) અતિચાર, અતલસ, અતોલ, અતીવ

1)B, 2)D, 3)A, 4)C, 5)A, 6)B, 7)B, 8)B, 9)C, 10)C, 11)C, 12)C, 13)D, 14)C, 15)B, 16)C, 17)B, 18)A, 19)C, 20)A, 21)B.

22. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
મિથુન જમીને ફરવા જતો.
A) વર્તમાન કૃદંત B) ભૂતકૃદંત
C) સંબંધક ભૂતકૃદંત D) હેત્વર્થકૃદંત

23. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ
A) ઝૂલણા B) દોહરો C) હરિગીત D) સવૈયા

24. નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.
અતડું
A) અલગ B) તડું C) મિલનસાર D) અતર

25. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.
ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.
A) ક્રમવાચક B) કારણવાચક
C) સ્થળવાચક D) સમયવાચક

26. મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો.
A) મતતભનગાગા B) મભતતનગાગા
C) મતનભનગાગા D) મભનતતગાગા

27. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
લાટ હોત તો લેત. કણબી છુ. નઈ લઉં.
A) પણ, એટલે B) તો, પણ
C) જ્યાં...ત્યાં D) અથવા, માટે

28. નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
A) આંગલુ-ઝભલું B) આગલું- આંગળુ
C) ઈનામ-બક્ષિસ D) ઈમાન-પ્રામાણિકતા

29. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
મારા ભાઈનું બારમું પતી ગયું.
A) ઉપમા B) વ્યતિરેક C) શ્લેષ D) વ્યાજસ્તુતિ

30. નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.
A) ગિલો ગામમાં ગયો B) યામિનીનું મુખ ચંદ્ર
C) દમયંતીનું મુખ જાણે ચંદ્ર D) સત્ય પરમેશ્વર છે.

રેવન્યૂ તલાટી - 28/02/2016

31. 'બેઠીબેઠી સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ કયા છંદમાં છે?
A) મંદાક્રાંતા B) પૃથ્વી C) હરિગીત D) હરિણી

32. નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ?
A) જ સ જ સ ય લ ગા B) ય મ ન સ ભ લ ગા
C) મ સ જ સ ત ત ગા D) મ ર ભ ન ય ય ય

33. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી
A) હોલ B) આંગણુ C) સ્ટોરરૂમ D) ગજાર

34. નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.
A) કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ
B) યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ
C) ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ
D) ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ

35. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો.
શ્રુતિ -
A) શ્વેત B) વેદ C) શ્રમ D) વિલાસી

36. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ
A) હેતુ + આભાસ B) હેતૂ + આભાસ
C) હેતવ + આભાસ D) હેતવ + ભાસ

37. નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
A) અધમૂઓ B) ભજન મંડળી C) સિંહાસન D) રેવાશંકર

38. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'
A) ઘરમાં સવારે છાશ વલોવવી
B) ધમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી
C) કપોળ કલ્પનામાં રાચવું
D) ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી

39. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
A) અતિરીક્ત B) અદ્દભૂત C) દિક્ષીત D) મોંસૂઝણું

40. નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ?
A) ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર
B) નવી નવી ઇચ્છાઓ થવી-ઉકરાટા
C) દુઃખનો પોકાર-આર્તનાદ
D) હું પણાનો ભાર-સ્વાભિમાન

41. નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?
A) દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
B) ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો
C) ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
D) ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ

42. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
પડો વજાડવો -
A) ઢોલ વગાડવો B) જાણ કરવી
C) ખબર પડવી D) જાહેરાત કરવી

43. 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
A) અનન્વય B) સજીવારોપણ C) ઉપમા D) ઉત્પ્રેક્ષા

44. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.
A) દ્વિતીયા તત્પુરુષ B) પ્રથમા તત્પુરુષ
C) તૃતીયા તત્પુરુષ D) ચતુર્થી તત્પુરુષ

22)C, 23)D, 24)C, 25)D, 26)D, 27)A, 28)B, 29)C, 30)A, 31)A, 32)C, 33)D, 34)D, 35)B, 36)A, 37)A, 38)C, 39)D, 40)D, 41)C, 42)D, 43)D, 44)C.

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

45. "ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબનો રંગ"-આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.
A)ઉત્પ્રેક્ષા B)ઉપમા C)યમક D)વર્ણાનુપ્રાસ

46. નીચેની પંક્તિઓનો છંદ જણાવો.
પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત
ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા
A)અનુષ્ટુપ B)ચોપાઈ C)દોહરો D)મનહર

47. 'લોહી'શબ્દનો સમાનાર્થી આપો.
A)શર્વરી B)શેણીત C)શોણિત D)રજની

48. સંધિ છૂટી પાડો -મધ્યાહ્ન
A)મધ્ય + અહ્ન B)મધ્યા + અહ્ન
C)મધ્ય + આહ્ન D)મધ્યા + આહ્ન

49. સમાસ ઓળખાવો-શુચિસ્મિતા
A)કર્મધારય B)તત્પુરુષ C)બહુવ્રીહિ D)દ્વન્દ્વ

50. સાચી જોડણી જણાવો.
A)અભીસારીકા B)અભિસારીકા
C)અભિસારિકા D)અભીસારિકા

51. "બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ?
A)ખૂબ શ્રીમંત હોવુ B)ગજા ઉપરાંતનો ખર્ચ કરવો
C)ખૂબ ગરીબ હોવુ D)હાથી પાળવો

52. ભાગતા ભૂતની ચોટલી પણ સારી- કહેવતનો અર્થ.
A)ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ
B)ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે
C)ભૂતની ચોટલી નસીબદારને મળે
D)માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે.

53. 'દીવો લઈને કૂવામાં પડવું'- કહેવતનો અર્થ.
A)મફતની વસ્તુના દોષ ન જોવા
B)જાણી જોઈએ આફતમાં મૂકાવું
C)ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી
D)કામ કરવું ને શરમ રાખવી

54. વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન
A)ભયભીત B)નિરર્થક C)પ્રફુલ્લ D)નિરપેક્ષ

55. સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર
A)માહીર B)મયંક C)સુવાસવ D)વાસવ

56. સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક
A)વડ B)ગુલમહોર C)કમળ D)કેસુડો

57. સાચી જોડણી શોધો.
A)સચ્ચિદાનંદ B)સચ્ચીદાનંદ C)બંને સાચી D)બંને ખોટી

58. સાચી જોડણી શોધો.
A)મુલ્યપત્રીકા B)મૂલ્યપત્રિકા C)મુલ્યપત્રિકા D)મૂલ્યપત્રીકા

59. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય
A)ઈચ્છિત B)સ્પૃહણીય C)ઈચ્છાયોગ્ય D)ઐચ્છુક

60. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી
A)દ્વિતીયા B)અનામીકા C)તર્જની D)પ્રથમી

61. 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહી'- કૃદંત ઓળખાવો.
A)વર્તમાનકૃદંત B)ભૂતકૃદંત
C)ભવિષ્ય કૃદંત D)હેત્વર્થ કૃદંત

62. મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ?
A)16, 15 B)15, 16 C)16, 17 D)17, 16

63. અલંકાર ઓળખાવો.
'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ
વિદ્યા ભણીયો જેહ, તેહ થૈરવૈભવ રૂડો.'
A)અંત્યાનુપ્રાસ B)શબ્દાનુપ્રાસ
C)આંતરપ્રાસ D)ઉપમા

64. સાચી જોડણી જણાવો.
A)ગુજરાત વિદ્યાપિઠ B)ગુજરાત વિદ્યાપીઠ
C)ગૂજરાત વિદ્યાપીઠ D)ઉક્ત પૈકી એકપણ નહીં

65. નીચેનામાંથી નિપાત ઓળખો.
દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા.
A)માં B)આ C)ની D)સુદ્ધાં

66. નીચેના વાક્યમાં ક્રિયાપદ ક્યા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં'
A)કર્તરી B)ભાવે C)કર્મણી D)પ્રેરક

67. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.'
A)અનુસ્વર B)અનુસ્વાર
C)સ્વરાનુનાસીક D)સ્વરાનુનાસિક

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

68. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
A)પરીચીત B)પરીચિત C)પરિચીત D)પરિચિત

69. સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'
A)શરતવાચક B)પરિણામવાચક
C)સમુચ્ચયવાચક D)અવતરણવાચક

70. કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ દેખાય છે ?
A)દિનકર જોષી B)કનૈયાલાલ મુનશી
C)ધૂમકેતુ D)પન્નાલાલ પટેલ

71. સમાસ ઓળખાવો : સર્વજ્ઞ
A)દ્વિગુ B)તત્પુરુષ C)ઉપપદ D)દ્વન્દ્વ

45)D, 46)B, 47)C, 48)A, 49)C, 50)C, 51)A, 52)A, 53)B, 54)C, 55)D, 56)D, 57)A, 58)B, 59)B, 60)C, 61)B, 62)A, 63)C, 64)C, 65)D, 66)B, 67)B, 68)D, 69)D, 70)B, 71)C.

72. રૂઢિ પ્રયોગનો અર્થ લખો.
કાંકરો નાખવો
A)અડચણ ઊભી કરવી B)ઝીણા પથ્થર નાંખવા
C)નડતર દૂર કરવું D)કાંકરા ફેંકવા

73. વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ
A)સર્વજ્ઞ B)શત્રુઘ્ન C)કૃતઘ્ન D)વિઘ્ન

74. વિશેષણ શોધીને લખો. 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી'
A)હતી B)વાદળી C)તેણે D)ચડ્ડી

75. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
A)વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ
B)વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ
C)વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ
D)વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ

76. નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ?
A)દર્પ-ઘાસ B)ગિરા-વાણી
C)કચૂડો-હીંચકો D)કૃપણ-કંજુસ

77. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.'
A)સમૂહવાચક B)જાતિવાચક
C)ભાવવાચક D)વ્યક્તિ વાચક

78. સમાસ ઓળખાવો : હાથચાલાકી
A)દ્વિગુ B)કર્મધારય C)તત્પુરુષ D)બહુવ્રીહિ

79. નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.
A)જ B)રહી C)બસ D)ગામ

80. અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અગણ્યા અપરાધોનું જન્મસ્થાન.
A)અનન્વય B)ઉત્પ્રેક્ષા C)શ્લેષ D)રૂપક

81. નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ?
A)આસ્તિક-નાસ્તિક B)અદ્વૈત-દ્વૈત
C)અથ-ઈતિ D)જ્યેષ્ઠ-ભાદ્રપાદ

82. છંદ ઓળખાવો : સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.
A)વસંતતિલકા B) મનહર C)મંદાક્રાંતા
D)હરિગીત

83. રૂઢિપ્રયોગનો અર્થ લખો. : કાળ ચડવો
A)આનંદ થવો B)ગુસ્સો આવવો
C)કાળા થવું D)ભૂખ લાગવી

84. વિશેષણ શોધીને લખો : દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી
A)શ્રદ્ધા B)અટલ C)દરેક D)ઉપર

85. સંધિ લખો. : વાક્ + ઈશ
A)વાગીશ B)વાકેશ C)વાકીશ D)વાગેશ

86. નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.'
A)રંગ B)પણ C)દીવાલ D)બારી

87. અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે'
A)વ્યાજસ્તુતિ B)ઉપમા C)અનન્વય D)યમક

88. કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી.
A)તેલ જોયા પછી તેલની ધાર જોવી
B)કાર્ય સમજી વિચારીને કરવુ
C)તેલની ધાર પ્રમાણે કામ કરવું
D)કાર્ય ઝડપથી પૂરું કરવું

89. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો'
A)પ્રાયમસ B)ચૂલ C)સગડી D)સગડો

90. સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ'
A)મૃગજળ B)છાતી C)ઝાકળ D)કઠોળ

91. સંધિ લખો : રઘુ + ઉત્તમ
A)રઘૂત્તમ B)રઘૂતમ C)રઘુત્તમ D)રઘોત્તમ

92. છંદ ઓળખાવો.
'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,
લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.'
A)દોહરો B)શિખરિણી C)અનુષ્ટુપ D)ચોપાઈ

93. શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
A)માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક
B)મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય
C)મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ
D)મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ

94. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ
A)ગળથૂથી B)ચ્યવનપ્રાશ C)શરબત D)પંચામૃત

95. નીચે પૈકી સાચી જોડણી કઈ છે ?
A)તિલાંજલી B)તીલાંજલી C)તિલાંજલિ D)તીલાંજલિ

96. કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ્ય વેરી'
A)સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે
B)સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.
C)સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે
D)ગરજ હોય તો પણ વૈદ્ય વેરી બને છે.

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

97. નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?
A)મુજથી ખડખડાટ હસી પડાયું
B)બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા
C)સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાછે
D)દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે

72)A, 73)C, 74)B, 75)C, 76)A, 77)C, 78)C, 79)A, 80)D, 81)D, 82)A, 83)B, 84)B, 85)A, 86)B, 87)B, 88)B, 89)B, 90)B, 91)A, 92)D, 93)D, 94)A, 95)C, 96)A, 97)A.

98. 'સૂપતી'નો અર્થ છે..........
A) રાજા B) સલાટની હથોડી
C) સારો પતિ D) સૂપ બનાવનાર

99. 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે'- ક્યો અલંકાર છે ?
A) ઉત્પ્રેક્ષા B) વ્યાજસ્તુતિ C) વ્યતિરેક D) ઉપમા

100. શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ ક્યો આવે ?
A) ખ્વાબ B) વીરતા C) ક્ષમા D) સ્નેહ

101. 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ'- માટે એક શબ્દ ક્યો ?
A) ત્રિકલ્પ B) રણદ્વીપ C) અખાત D) દ્વીપકલ્પ

102. આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ?
A) ઢમઢોલ માંહે પોલ B) અધૂરો ઘડો છલકાય
C) ખાલી ચણો વાગે ઘણો D) ઊજળું એટલું દૂધ નહીં

103. 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો'- આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ?
A) સંયોજક B) કૃદંત C) ક્રિયા વિશેષણ D) વિશેષણ

104. 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા'- એટલે શું ?
A) જીવ્યા કરતાં જોયું ભલું
B) મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
C) કામ ખૂબ જ સહેલું હોવું
D) ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો

105. 'કોઈનેય વધારે કામ કરવું નથી'- વધારે - વિશેષણનો પ્રકાર ક્યો છે ?
A) સંખ્યાવાચક B) પરિમાણવાચક
C) ગુણવાચક D) સાપેક્ષ

106. પદભ્રષ્ટ ક્યો સમાસ છે ?
A) કર્મધારય B) દ્વિગુ C) ઉપપદ D) તત્પુરુષ

107. 'તન્વી'નો સંધિ વિગ્રહ શું થશે ?
A) તનુ + ઈ B) તન્ + વી C) તનુ + વી D) ત + અન્વી

108. 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.'- આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો.
A) નામે એક મહાત્મા B) થઈ ગયા
C) ભારતમાં D) એક ગાંધીજી

109. 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'- આ વાક્યમાંથી નિપાત શોધો.
A) દસ B) ફક્ત C) આવી D) મિનિટમાં

110. અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ?
A) વિભાવરી B) શર્વરી C) યામિની D) ભામિની

111. 'જુઓ પેલો ચોર ભાગ્યો !' -પેલો કેવા પ્રકારનું સર્વનામ છે ?
A) દર્શક સર્વનામ B) વ્યક્તિવાચક સર્વનામ
C) સાપેક્ષ સર્વનામ D) સ્વવાચક સર્વનામ

112. નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ ક્યો છે ?
A) દરિયો B) પૈસાદાર C) ડરવું D) ઊંડું

113. 'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો'- આ વાક્યનો પ્રકાર ક્યો છે ?
A) પ્રેરક વાક્ય B) સાદું વાક્ય
C) સંયુક્ત વાક્ય D) સંકુલ વાક્ય

114. યમનસભલગા - આ ક્યા છંદનું બંધારણ છે ?
A) પૃથ્વી B) હરિણી C) શિખરિણી D) મંદાક્રાંતા

115. સાચી જોડણીવાળુ શબ્દજૂથ ક્યું છે ?
A) પૃથ્થકરણ, મિલ્કત B) શૌર્યતા, જીંદગી
C) સંન્યાસી, પુનરુચ્ચાર D) નિરાભિમાની, ક્ષિતિય

116. 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય'- આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ ક્યું છે ?
A) જવાબ B) નહીં C) ભૂલ D) તેથી

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

117. 'મંદ'નો નજીકનો સમાનાર્થી ક્યો ?
A) પોચું B) સ્થિર C) ધીમું D) ઢીલું

118. કઈ જોડણી સાચી ?
A) કીર્તિ B) કિર્તી C) કિર્તિ D) કીર્તિ

119. કઈ જોડણી સાચી ?
A) મ્યુનિસિપાલિટી B) મ્યૂનીસીપાલીટી
C) મ્યુનીસીપાલીટી D) મ્યુનિસિપાલિટિ

120. 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ?
A) ટોળું B) ટોળાં C) ટોળી D) ટોળકી

121. 'માતાપિતા' ક્યો સમાસ છે ?
A) તત્પુરુષ B) દ્વંદ્વ C) દ્વિગુ D) બહુવ્રીહિ

122. હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે?
A) હિન્દી B) ઉર્દૂ
C) અરબી-ફારસી D) અંગ્રેજી

123. 'બાહોશ'નો નજીકનો સમાનાર્થી ક્યો ?
A) આળસુ B) હોંશિયાર C) કાર્યકુશળ D) પાવરધો

124. 'રવીન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?
A) રિવિ + ઈન્દ્ર B) રવિ + ઊન્દ્ર
C) રવી + ઈન્દ્ર D) રવિ + ઈન્દ્ર

125. ક્યું વાક્ય બેહૂદું છે ?
A) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
B) હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા
C) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
D) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

126. ક્યું વાક્ય સાચું ?
A) દરેકે વિદ્યાર્થીઓને.... B) દરેક-દરેક વિદ્યાર્થીઓને
C) દરેક વિદ્યાર્થીઓને... D) દરેક વિદ્યાર્થીને...

98)B, 99)C, 100)C, 101)D, 102)D, 103)C, 104)B, 105)B, 106)D, 107)A, 108)D, 109)B, 110)D, 111)A, 112)A, 113)B, 114)C, 115)C, 116)D, 117)C, 118)A, 119)A, 120)A, 121)B, 122)D, 123)C, 124)D, 125)C, 126)D.

127. કઈ જોડણી સાચી છે ?

A) આશીવાર્દ B) આશીરવાદ C) આશીર્વાદ D) આર્શીવાદ

જૂનિયર કલાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

128. સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ?

A) છપ્પા B) ઊર્મિગીત C) પદ D) હાઈકુ

129. નીચેનામાંથી 'પ્રશસ્તિ'નો વિરોધી શબ્દ જણાવો.

A) સ્તુતિ B) નિંદા C) વખાણ D) પ્રશંસા

130. 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ?

A) વેવાઈ પક્ષના લોકો B) સાથે યુદ્ધ કરવાવાળો

C) યજ્ઞમાં હોમવાના લાકડાં D) એક શિકારી પક્ષી

131. નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ?

A) મહેનત B) પ્રારબ્ધ C) પરિશ્રમ D) પુરુષાર્થ

132. મંદાક્રાન્તા છંદનું બંધારણ ઓળખાવો.

A) ન સ મ ર સ લ ગા B) જ સ જ સ ય લ ગા

C) ય મ ન સ ભ લ ગા D) મ ભ ન ત ત ગા ગા

133. 'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

A) માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.

B) બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા

C) બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.

D) બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.

134. 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા'- રેખાંકિત પદ ઓળખાવો.

A) સંખ્યાવાચક વિશેષણ B) ક્રમવાચક વિશેષણ

C) ભાવવાચક વિશેષણ D) ગુણવાચક વિશેષણ

135. 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર'- શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ?

A) પાલવ B) સાડી C) મીંઢળ D) પાનેતર

136. 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી'- પંક્તિનો છંદ ઓળખાવો.

A) મંદાક્રાન્તા B) મનહર C) પૃથ્વી D) શિખરિણી

137. ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

A) કાકલૂદી B) વીચીત્ર C) નિવૃત્ત D) ભૂમિકા

138. 'મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા'-રેખાંકિત પદ ઓળખાવો.

A) નિપાત B) સર્વનામ C) કૃદંત D) વિશેષણ

139. 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો.

A) ઉત્પ્રેક્ષા B) રૂપક C) ઉપમા D) વર્ણાનુપ્રાસ

140. નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

A) દેશપ્રેમ B) વનવાસ C) પાપપુણ્ય D) સ્નેહાધિન

141. 'નાક-લીટી તાણવી'- રૂઢિપ્રયોગનો અર્થ આપો.

A) સાષ્ટાંગ દંડવત પ્રમાણ કરવા B) ભૂલનો સ્વીકાર કરવો

C) અત્યંત દીનપણે શરણે જવું D) જીવ કરવી

142. 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો.

A) સૂ + અચ્છ B) સ્વ + છ C) સ્વ + અચ્છ D) સુ + અચ્છ

143. 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહ્યું'- રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

A) સંબંધ વિભક્તિ B) અધિકરણ વિભક્તિ

C) અપાદાન વિભક્તિ D) કરણ વિભક્તિ

જૂનિયર કલાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

144. અનધિકૃતની સંધિ કઈ છે ?

A) અન્ + અધિકૃત B) અન + અધિકૃત

C) અન્ + ધિકૃત D) અન્ય + ધિકૃત

145. દૂધનો સમાનાર્થી શબ્દ કયો ?

A) ખીર B) ક્ષીર

C) અમૃત D) એકપણ નહીં

146. જયેસઠની સાચી જોડણી કઈ છે ?

A) જ્યેસ્ઠ B) જયેષ્ઠ C) જયેઠ D) જયેશઠ

147. 'પાણીપોચું' એટલે............

A) કમળ B) કોમળ C) કઠોર D) પાણી જેવું

148. 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ?

A) મનિશા B) મનીસા C) મનિષા D) મનીષા

149. જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી ? - કયો છંદ છે ?

A) હરિગીત B) દોહરો C) સવૈયા D) મંદાક્રાંતા

150. 'વરદાન' એટલે

A) દાન B) નિરાંત C) દુઆ D) પાક

151. ચતુસ + ઘાતની સંધિ શું થશે ?

A) ચતુષ્ઘાત B) ચતઘાત C) ચતુઃ ઘાત D) ચતુસ્ઘાત

152. 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ...............છે.

A) નિશ્ચિત B) પળ C) શાશ્વત D) તરત

153. સૂકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટ એક શબ્દ.

A) ઓઘલી B) તગાવી C) ડુંગરી D) વખો

154. કઈ જોડણી સાચી છે ?

A) પાઈદળ B) પૃથિવીવલ્લભ C) રમણિ D) અંકુસ

155. આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

A) આંદોલનમાં જોડાવું B) મેદાન છોડી જવું

C) ભાવવિભોર થવું D) રોમાંચિત થઈ ઊઠવું

156. 'સાર્થક' એટલે...........

A) પૃથ્વી B) સફળ C) પાદડું D) સારથી

157. મોરચો સંભાળવો-એટલે

A) સ્થળ છોડી દેવું B) આગેવાની લેવી

C) આંદોલન કરવું D) વિરોધ પ્રદર્શન કરવું

127)C, 128)A, 129)B, 130)C, 131)B, 132)D, 133)C, 134)D, 135)D, 136)C, 137)B, 138)A, 139)A, 140)C, 141)C, 142)D, 143)D, 144)A, 145)B, 146)C, 147)B, 148)D, 149)A, 150)C, 151)A, 152)C, 153)A, 154)B, 155)D, 156)B, 157)B.

158. નીચેના પૈકી કયો શબ્દ વાઘનો સમાનાર્થી છે ?
A) સાવજ B) શાર્દૂલ C) વિક્રાંત D) સમેર

159. નિર્ + અવધિ = ...
A) નિરાવધિ B) નિપાવધિ C) નિરઅવધિ D) નિરવધિ

160. પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?
A) શાંતિ થવી B) વિસામો લેવો
C) આડોડાઈ કરવી D) શાંતિ હણવી

161. શૃંગ એટલે શું ?
A) સુંદરતા B) શૃંગાર C) શિખર D) આબેહૂબ

162. 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ?
A) અશુદ્ધ B) શુદ્ધ C) અંત D) વચેટ

163. પૂર્વાભિમુખ એટલે............
A) પૂર્વ દિશા તરફ B) પૂર્વની પાછળ
C) પૂર્વની ઉપર D) પૂર્વની નીચે

164. નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી.
A) વર્ણાનુપ્રાસ B) શબ્દાનુપ્રાસ C) ઉત્પ્રેક્ષા D) મંદાક્રાન્તા

165. નિઃસ્પૃહ એટલે...........
A) ઈચ્છા વિનાનું B) આધ્યાત્મિક સ્થિતિ
C) દિશા અને કામ D) એકરૂપતા

166. 'કૂથલી' શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ....છે.
A) નિંદા B) પ્રશંસા C) તોછડું D) વિવેકી

167. 'દેવ જાગી જવા' એટલે.........
A) સવાર થઈ જવી B) નસીબ ખુલી જવું
C) ખાવાના સાસાં પડી જવા D) દોડાદોડી કરવી

168. નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી.
A) અનિલ B) નાદ C) સ્વર D) નિનાદ

169. 'અધમ'નો સમાનાર્થી ....છે.
A) ઉપજ B) હીણ C) પેદાશ D) હકૂમત

170. 'ખંત' એટલે............
A) પત્ર B) ખાંભી C) ધગશ D) ખાણ

171. 'મત્સર'નો સમાનાર્થી શબ્દ............છે.
A) અદેખાઈ B) મચ્છર C) સાક્ષર D) મુત્સદ્દી

172. 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.
A) આનંદમાં આવવું B) સંઘર્ષમાં ઉતરવું
C) ખૂબ અધીરા બની જવું D) ઉમંગમાં આવી જવું

173. ઉત્પ્લવની સંધિ કઈ ?
A) ઉત્ + પ્લવ B) ઉદ્ + પ્લવ C) ઉચ્ + પ્લવ D) ઉજ્ + પ્લવ

174. હારજીત કયો સમાસ છે ?
A) અવ્યયીભાવ B) દ્વિગુ
C) તત્પુરુષ D) દ્વન્દ્વ

175. પિતૃ + ઔદાર્ય =...........
A) પિતૌદાર્ય B) પિતૃ ઔદર્ય C) પિત્રૌદાર્ય D) પિત્રોદાર્ય

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

176. 'વમળ' શબ્દ કયા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ?
A) કાદવમાં ઊગેલા કમળ માટે
B) પવનની લહેર માટે
C) નદીના વળાંક માટે
D) વહેતા પાણીમાં થતા કુંડાળા માટે

177. નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ?
A) પાણીકળો B) ભયંકર C) ગોપાળ D) ઘનશ્યામ

178. નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.
A) મનોરથ = મનુ + રથ B) વ્યસ્ત = વિ + અસ્ત
C) પૃથ્વી = પૃ + ઈથી D) યોગેશ = યોગા + ઈશ

179. કઈ જોડણી ખોટી છે ?
A) સ્વાભાવિક B) ખૂબસુરત C) જિજ્ઞાસા D) ઐતિહાસિક

180. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
A) પરોણો B) મહેમાન C) અતિથિ D) યજમાન

181. શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ?
A) ઉપર, એકલવાયુ, ચગડોળ, ઘરમ
B) આવળ, બાવળ, બોરડી, આજે
C) ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ
D) ફુલ, તપ, બગલો, નમસ્તે

182. નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો.
A) માયાળુ B) મધુર C) ચળકાટ D) સાંસારિક

183. ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ?
A) યમક B) શ્લેષ C) રૂપક D) ઉપમા

184. નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ?
A) ઘનશ્યામ B) દીવાદાંડી C) જીવનયાત્રા D) નંદકુંવર

185. બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?
A) ગપ્પા મારવા B) કુસ્તી ન કરવી
C) મુખ સિવાઈ જવું D) અખાડા કરવા

186. 'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો.
A) ખાડો ખોદે તે પડે
B) એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ?
C) સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે
D) એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે

187. નાકલીટી ખેંચવી એટલે ?
A) આજીજી કરવી B) નાપાસ કરવો
C) નાક પર લીટી દોરવી D) હુકમ કરવોદ

188. 'તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના'- છંદ ઓળખાવો.
A) શાર્દૂલવિક્રીડિત B) મંદાક્રાંતા
C) હરિગીત D) સવૈયા

158)B, 159)D, 160)B, 161)C, 162)B, 163)A, 164)D, 165)A, 166)B, 167)B, 168)A, 169)B, 170)C, 171)A, 172)C, 173)B, 174)D, 175)C, 176)D, 177)D, 178)B, 179)B, 180)D, 181)A, 182)C, 183)C, 184)A, 185)D, 186)D, 187)A, 188)C.

189. કઈ સંધિ ખોટી છે ?

A) યથા + ઈચ્છ = યથેચ્છ B) સરસ્ + વર = સરોવર

C) ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક D) ઉદ્ + નત = ઉન્નત

190. ક્યું વિરોધી જોડકું સાચું છે ?

A) ઉપજાઉ - ફળદ્રુપ B) મંડન- સમર્થન

C) અધોગામી - ઊર્ધ્વગામી D) સમૂહ-સમષ્ટિ

191. શબ્દકોશ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે ?

A) આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ

B) લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ

C) બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ

D) આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ

192. કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ?

A) સંપ ત્યાં જંપ B) કાંકરે કાંકરે પાળ બંધાય

C) ઝાઝા હાથ રળિયામણા D) એક હાથે તાળી ન પડે

193. સાચી જોડણી શોધો.

A) આશિર્વાદ B) આર્શીવાદ C) આશીર્વાદ D) આસિર્વાદ

194. અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

A) મંનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ

B) મામા આવ્યા, લાવ્યા મજાની વાતો

C) સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ

D) સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો.

195. નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે ?

A) દોહરો B) ચોપાઈ C) હરિગીત D) મનહર

196. નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?

A) રજની + ઈશ = રજનીશ B) તથ + અપિ = તથાપિ

C) પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ D) પો + અન = પવન

197. 'વિષમ'ની સાચી સંધિ છોડો.

A) વિ + સમ B) વિ + ષમ C) વિષ્ + મ D) વિસ્ + મ

198. નીચેનામાંથી ક્યો શબ્દ અવિકારી વિશેષણ છે ?

A) સસ્તી B) ચતુર C) સારી D) મીઠું

199. ત, થ, દ અને ધ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે ક્યા વ્યંજનના વર્ગો છે?

A) મૂર્ધન્ય B) દંત્ય C) કંઠ્ય D) ઔષ્ઠ્ય

200. નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો.

A) ઉછંગ B) ખોબો C) ઉદક D) સલિલ

201. ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

A) નળ B) બેડી C) નાળ D) લગામ

202. નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી ?

A) યામિની B) શર્વરી C) દામિની D) નિશા

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017)

203. 'તત્ત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

A) સત્ તત્ત્વ આત્મા છે.

B) સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.

C) એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.

D) તે આત્મા તું જ છે.

204. 'સંશયાત્મા વિનશ્યતિ'નો ખરો અર્થ થાય.....

A) ત્યાગ કરો અને સુખ ભોગવો

B) વહેમ રાખનારનો વિનાશ થાય છે

C) મારા ભક્તનો કદી નાશ થતો નથી

D) જેવું કર્મ તેવું ફળ

205. શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ છે. - કઈ?

A) અભિધા, લક્ષણા અને વ્યંજના

B) સત્વ, રજસ અને તમસ

C) ઉત્તમ, મધ્યમ, અને સામાન્ય

D) લિપી, વાણિ અને જ્ઞાન

206. 'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય.....

A) સુવાચ્ય ગ્રંથ

B) શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ

C) માહિતી કોશ

D) વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ

207. 'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં ક્યું જૂથ અસંગત છે?

A) કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા-રામનું સપનું ભરતને ફળ્યું

B) વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા

C) ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે

D) ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરું ચગળે

208. નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે?

A) આડા લાકડો આડો વહેર-પાકે ઘડે કાંઠા ન ચઢે

B) ઘડીમાં તોલો ને ઘડીમાં માસો-અસ્થિર ને ચંચળ મનવાળા હોવું

C) દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય.

D) ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી.

209. નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી ક્યું વિગતજૂથ ખોટું છે?

A) ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે

B) બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ

C) સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે

D) માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ

189)C, 190)C, 191)D, 192)B, 193)C, 194)C, 195)D, 196)B, 197)A, 198)B, 199)B, 200)A, 201)C, 202)C, 203)D, 204)B, 205)A, 206)D, 207)C, 208)A, 209)D.

210. નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે?
A) ફીફાં ખાંડવાં - ઘાસ કાપવું
B) વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં
C) વાએ વાદળ ખસવું - ઘાતનું વતેસર થવું
D) પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું

211. નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે?
A) માથે ઝાડ ઉગવાં બાકી હોવાં-ઘણાં જ દુઃખ પડવા
B) માથું ઊંચકવું -ઊંચે જોવું
C) માથું આપવું - બલિદાન આપવું
D) માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો

212. 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ?
A) પગ પાછા પડવા B) પગ ભારે થવો
C) પગ ધરતી પર ન રહેવા D) પગ જમાવવો

213. 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો.
A) જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય
B) જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય
C) જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય
D) જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય

214. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા'
A) આત્મશ્લાઘા B) આત્માનો અવાજ
C) આત્મવંચના D) સ્વપરિચય

215. નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ'
A) દિક્પાલ B) ઐરાવત C) દિગ્ગજ D) દિગ્વિજય

216. નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી?
A) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય
B) આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી
C) દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને
D) ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ

217. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ' હાર કબૂલ કરવી' એવો થાય છે?
A) કાગનો વાઘ થવો B) નાક કપાવવું
C) પેટ ચોળીને શૂળ ઊભું કરવું D) હથિયાર હેઠાં મૂકવાં

218. 'મુખરિત' શબ્દનો વિરોધી શબ્દ શોધો.
A) મૂક B) કંઠસ્થ C) બોલકો D) મુખ વગરનું

219. વળે વળ ઉતારવો એટલે.......
A) વધારી વધારીને વાત કરવી
B) મુશ્કેલ કાર્ય કરવું
C) સામર્થ્યપૂર્વક કામ કરવું
D) બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું

220. નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો.
A) સુદર્શન B) સુસ્વાગતમ્ C) સુપરિચિત D) સુપ્રભાતમ્

221. ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે?
A) કર્તા-ક્રિયાપદ-કર્મ B) ક્રિયાપદ-કર્મ-કર્તા
C) કર્મ-ક્રિયાપદ-કર્તા D) કર્તા-કર્મ-ક્રિયાપદ

222. નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો.
A) સર્વ + ઉદય = સર્વોદય B) હર + ઈન્દ્ર = હરેન્દ્ર
C) મહા + ઔદાર્ય = મહૌદાર્ય D) પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ

223. નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો.
A) રાજ + ઋષિ = રાજર્ષિ B) મન્વ + અન્તર = મન્વન્તર
C) તલ્ + લીન = તલ્લીન D) સદ + ઉપયોગ = સદુપયોગ

224. નીચે આપેલા સમાસમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી?
A) ભરસભા B) અનુભવજ્ઞાન C) ટપાલપેટી D) મહત્વાકાંક્ષા

225. નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે?
A) હું માનવી માનવ થાઉં તો ઘણું
B) માનવસેવા એ જ પ્રભુસેવા
C) નકામી ચીજો શા માટે ભેગી કરો છો?
D) સારા અક્ષર કેળવણીની નિશાની છે.

226. નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો.
A) એના શબ્દો જાણે બંદુકમાંથી છૂટતી ગોળીયો
B) ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા
C) ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે
D) મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને!

227. નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે?
A) આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
B) વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.
C) મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો?
D) એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.

228. નીચેના વાક્યોમાં નિપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો.
A) કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો
B) હું પણ એણી સાથે જ ભણ્યો છું
C) તમે આવ્યા તે સારું જ કર્યું
D) એ અંતે પાસ તો થયો.

210)C, 211)B, 212)C, 213)C, 214)A, 215)C, 216)C, 217)D, 218)A, 219)D, 220)B, 221)D, 222)D, 223)A, 224)A, 225)B, 226)C, 227)D, 228)A.

229. 'આ ફૂલ કેવું સુંદર છે' વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો?
A)અવતરણ ચિહ્ન B)ઉદ્ગારવાચક
C)પ્રશ્નચિહ્ન D)પૂર્ણ વિરામ

230. નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો.
A)તેનું રૂપ અદ્ભુત છે. - આ વિધાન વાક્ય છે.
B)કિંતમ એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે.
C) 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય
D)નો-ની-નું-નાં - આ પ્રત્યયો પંચમી વિભક્તિના છે.

231. નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી?
A)સુંદર B)ચતુર C)ધર્મ D)મોટું

232. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો.
A)મ્યુનિસિપાલિટી B)મ્યુનિસીપાલિટિ
C)મ્યુનિસિપાલિટિ D)મ્યુનીસીપાલિટી

233. નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો.
A)ઝાડ પરથી પક્ષી ઊડી ગયું
B)કોઈ સારા માણસને પૂછો
C)પહેલાં તમે એની સાથે બોલતા નહીં
D)એ તમને પત્ર લખશે

234. નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દૃષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો.
A)દાણોપાણી B)દ્વિવેદી C)સેવાપૂજા D)ઊઠબેઠ

235. 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,
પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,
આપા દેવાતને શોભતી મહેનમાનગતિ કરીશ.
- આ વાક્ય કયા પ્રકારનું કહેવાય?
A)સંકુલ વાક્ય B)પ્રેરક વાક્ય C)સાદું વાક્ય D)સંયુક્ત વાક્ય

236. નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો.
A)કોશિશ B)વ્યાધિ C)દીન D)પરમિટ

237. નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો.
A)મિનિટ B)મિશન C) જિગર D)ફર્નિચર

238. નીચેનમાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો.
A)કૂતરો B)કોયલ C)કૂકડો D)કીડી

239. નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે?
A)ઘુઘરિયાળું B)શિખવણી C)દિવેલિયું D)વિદ્યાર્થીનિ

240. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?
A)રવિન્દ્ર B)મુહૂર્ત C)વૈજ્ઞાનીક D)પ્રજાકિય

241. નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો.
A)કોણ પડ્યું? B)મને બોલવું ગમતું નથી
C)પેલું મારું ગામ છે. D)જેવું કરશો તેવું પામશો

અહીં આપેલા પદ્યને આધારે પ્રશ્ન 242 થી 246 સુધીના પ્રશ્નોના જવાબ આપો.

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયાં, સુખ...
નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી,
અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખ...
પાંચ પાંડવ સરખા બંધવા, જેની દ્રૌપદી રાણી,
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિદ્રા ન આણી. સુખ...
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી,
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી. સુખ...
રાવણ સરખો રાજીયો, જેની મંદોદરી રાણી,
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી. સુખ...
હરિશ્ચન્દ્ર રાય સતવાદિયો, તારામતી રાણી,
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચે ઘેર પાણી. સુખ...
શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી,
ભોળવાયાં ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ...
સર્વ દેવને જ્યારે ભીડ પડી, સમર્યા અંતર જામી,
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી. સુખ....
('નરસિંહનાં પદો' માંથી)

242. નીચેનામાંથી તદ્દન વિરોધી અર્થ ધરાવતો પદસમૂહ કયો?
A)મહાદુઃખ B)અંતરજામી C)નળદમયંતી D)સુખદુઃખ

243. નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું દૃષ્ટાંત ન હોય તેવો શબ્દસમૂહ ઓળખાવો.
A)સીતા સરખી સતી B)પાંચ પાંડવ સરખા બંધવા
C)નયણે નિદ્રા ન આણી D)ભાવટ ભાંગી ભૂધરે

244. નીચે આપેલી જોડીઓમાં કઈ જોડી અસંગત છે?
A)રાવણ-સીતા B)શિવ-પાર્વતી
C)નળ-દમયંતી D)હરિશ્ચન્દ્ર- તારામતી

245. 'સુખદુઃખ' શબ્દમાં પહેલા શબ્દથી તદ્દન વિરુધ્ધની સ્થિતિ બીજો શબ્દ દર્શાવે છે. આ પ્રકારનાં નીચે આપેલાં શબ્દગુચ્છો કયું ગુચ્છ અસંગત છે?
A)ખાણી-પીણી B)નફો-તોટો
C)આવક-જાવક D)ચડતી-પડતી

246. કાવ્યમાં દર્શાવ્યા પ્રમાણે ....ને જ્યારે ભીડ પડી ત્યારે તેઓએ અંતરજામીનું સ્મરણ કર્યું અને ઉગર્યા.
A)દાનવો B)માનવો
C)નરસિંહ મહેતા D)દેવો

247. નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે?
A)દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી
B)બધું ભગવાનનું ધાર્યું થાય છે.
C)તે વ્યાકરણમાં નિષ્ણાત છે.
D)ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે.

229)B, 230)A, 231)C, 232)A, 233)C, 234)B, 235)A, 236)A, 237)C, 238)D, 239)D, 240)B, 241)C, 242)D, 243)B, 244)A, 245)A, 246)D, 247)A.

248. 'અઠે દ્વારકા' એટલે.....
A) દ્વારકાની યાત્રા કરવી B) અહીં જ દ્વારકા છે
C) દ્વારકા તરફ જવું D) લાંબા વખત ધામા નાખવા

249. 'જાળ બિછાવવી' એટલે......
A) ખોળો પાથરવો B) જાળ પાથરી દેવી
C) આવનારનું સ્વાગત કરવું D) કાવતરું કરવું

બિન સચિવાલય ક્લાર્ક - 2016

250. સાચી જોડણી દર્શાવો.
A) પ્રતિતિ B) પ્રતીતિ C) પ્રતિતી D) પ્રતીતી

251. 'પ્રકૃતિ જ મારી મા રહી છે '-વાક્યમાં કયું પદ 'નિપાત' છે ?
A) મા B) રહી C) જ D) છે

252. આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી'
A) ઉત્પ્રેક્ષા B) વ્યતિરેક C) ઉપમા D) સજીવારોપણ

253. ' મોરના ઈંડા ચીતરવાં ન પડે ' કહેવતનો અર્થ જણાવો.
A) ઈંડા સુદર ચીતરેલાં જ હોય.
B) માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
C) મોર સુંદર હોય તેથી
D) મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.

254. 'પતિયાર'શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
A) પતન B) પતિનો મિત્ર C) વિશ્વાસ D) પ્રમાણ

255. 'કૃતજ્ઞ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
A) કૃતઘ્ન B) ગરિમા C) કર્મઠ D) અજ્ઞાન

256. 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
A) લક્ષ્ય ન મળવું B) લક્ષ્ય સાધવું
C) લક્ષ્ય આપવું D) ધ્યેય સિદ્ધ ન થવું

257. માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?
A) હરિગીત B) સવૈયા C) દોહરો D) ચોપાઈ

258. 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો.
A) સૂ + ઉક્તિ B) સુ + ઉક્તિ C) સૂ + ઊક્તિ D) સ + ઊક્તિ

259. રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.
શ્રીકૃષ્ણ માટે <u>ગિરિધર</u> શબ્દ પણ પ્રયોજાય છે.
A) ઉપપદ B) તત્પુરુષ C) કર્મધારય D) દ્વિગુ

260. 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો.
A) ઘૂંઘટવાળી B) શ્યામવર્ણવાળી
C) મિથ્યાભિમાની D) તાબે થયેલ

261. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર લખો.
સ્વામીજીએ <u>આવીને</u> અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.
A) હેત્વર્થકૃદંત B) સંબંધક ભૂતકૃદંત
C) ભૂતકૃદંત D) ભવિષ્યકૃદંત

262. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
A) માત્ર B) વખત C) તમારે D) દસ

263. 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો.
A) આંતરપ્રાસ B) અંત્યાનુપ્રાસ C) વર્ણાનુપ્રાસ D) ઉપમા

264. 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.
A) એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા
B) કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
C) કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
D) સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

265. 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
A) નીતિ B) સ્તુતિ C) નિમિત્ત D) ભાગ્ય

266. 'સર્જન' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
A) સંસ્કારી B) ડૉક્ટર C) લીલા D) સંહાર

267. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
" બે પાંદડે થવું "
A) આર્થિક સ્થિતિ સારી થવી B) પાંદડા બે થવા
C) એકના બે થઈ જવું D) બેમત ના હોવું

268. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
A) દોહરો B) ચોપાઈ C) હરિગીત D) સવૈયા

269. સંધિ જોડો.
સુ + અલ્પ
A) સુઅલ્પ B) સ્વલ્પ C) સ્વાલ્પ D) સ્વલપ

270. સંધિ જોડો.
સિન્ધુ + ઊર્મિ
A) સિંધુઊર્મિ B) સિંધઊર્મિ C) સિંધુર્મિ D) સિન્ધૂર્મિ

271. નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ?
A) નખશિખ - બહુવ્રીહિ B) પંકજ - તત્પુરુષ
C) ટાઈમટેબલ - દ્વન્દ્વ D) ત્રિકાળ -ઉપપદ

272. ' વૈખરી' શબ્દનો અર્થ જણાવો.
A) નાહકની વહોરેલી પીડા
B) અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સમાન
C) વણસેલા સંબંધો
D) સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

273. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
<u>લખવું વાંચવું</u> એ કંઈ કેળવણી નથી.
A) વિધ્યર્થકૃદંત B) સંબંધકકૃદંત
C) ભવિષ્યકૃદંત D) વર્તમાનકૃદંત

274. સાચી જોડણી દર્શાવો.
A) યુનિવર્સિટી B) યુનીવર્સીટી C) યુનીવસિર્ટી D) યુનિવસીર્ટી

248)D, 249)D, 250)B, 251)C, 252)C, 253)B, 254)C,255)A, 256)B, 257)A, 258)B, 259)B, 260)A, 261)B, 262)A, 263)A, 264)A, 265)D, 266)D, 267)A, 268)A, 269)B, 270)D,271)A, 272)D, 273)A, 274)A.

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

275. નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.
A) ''રૂપે અરુણ ઉદય સરખો''
B) ''કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી''
C) ''ગુલછડી સમોવડી તે બાલિકા હતી''
D) '' મા તે મા, બીજા બધા વનવગડાના વા''

276. ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)
A)સમકાલીન B)સામાજિક C)સમોવડિયા D)સમકાલિક

277. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
અશ્વ -
A)તોખાર B)ગદર્ભ C)ખજ D)અજ

278. કઈ જોડી ખોટી છે તે શોધો.
A)કસ્તૂરી-સ્ત્રીલિંગ B)પૂંજી-પુલ્લિંગ
C)વસાણું-નપુંસકલિંગ D)ઓવરો-પુલ્લિંગ

279. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
સરસ્વતી -
A)સુંદર B)સૂરત C)ભારતી D)ભરતી

280. લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે?
A)ગોળો-ગોળી B)પલંગ-ખુરશી
C)પર્વત-દીવાલ D)બાળક-છોકરું

281. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.
ફૂવડ
A)ગંદકી B)સ્વસ્થ C)સુઘડ D)બેડોળ

282. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.
ઊખર -
A)ઊંડુ B)છીછરુ C)પતન D)ફળદ્રુપ

283. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.
A)દ્વન્દ્વ B)તત્પુરુષ C)બહુવ્રીહિ D)અવ્યયી ભાવ

284. સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો.
A)વાસ - સાથ B)કપટી - ઠગારું
C)ચૂવું - ટપકવું D)લાડણી - વહાલી

285. 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો.
A)અભિમાનમાં ખરાબ દેખાવ કરે
B)ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
C)સારા ખરાબનો કદી વિચાર ન કરે
D)કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે

286. 'પુત્રૈષણા'ની સંધિ છૂટી પાડો.
A)પુત્ર + ઐષણા B)પુત્ર + એષણા
C)પુત્રે + ષણા D)પુત્રૈ + ષણા

287. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.
A)લુચ્ચું - લુચ્ચાઈ B)દવા - દવાઈ
C)મધુર - માધુર્ય D)કુશળ - કુશળતા

288. નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.
પ્રતિ + એક
A)પ્રતિએક B)પ્રતયેક C)પ્રત્યેક D)પતાકા

289. ક્યું લિંગપરિવર્તન સાચું નથી ?
A)ધૂળ - ધૂળિયું B)ગધેડા - ગધેડી
C)જીભડી - જીભડો D)મૂંગો - મૂંગી

290. 'ખીલો થઈ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
A)ઊભા રહી જવું B)જડ થઈ જવું
C)ભીંતમાં ખીલો જડી દેવો D)અંદર જતા રહેવું

291. સાચી જોડણી શોધો.
A)જીજ્ઞાસા B)જિજ્ઞાષા C)જિજ્ઞાસા D)જીગ્નાશા

292. મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.
A)દ્વન્દ્વ B)મધ્યમપદ લોપી
C)કર્મધારય D)ઉપપદ

293. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
રહી રહીને પડતો વરસાદનું ઝાપટું
A)મૂશળધાર B)સાંબેલાધાર
C)સરવડું D)ટપકટપક પડવુ

294. આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)
A)મરુભૂમિ B)ખૂંપણ
C)કાંપાળ જમીન D)ચિકણી જમીન

GPSC પ્રિલીમ - 2001

295. આમાં 'અનુગામી'નો વિરોધાર્થી કોણ છે ?
A)પુરોગામી B)હંગામી C)અધોગામી D)ઉર્ધ્વગામી

296. આમાં જણસનું સમાનાર્થી કોણ ?
A)માણસ B)પ્રેત C)ચીજ D)જડ

297. ''સ્પષ્ટ''ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ?
A)વિસ્તૃત B)સંક્ષિપ્ત C)સંદિગ્ધ D)જૂઠું

PSI ખાતાકીય - 23/04/2017

298. ......એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવેગ છે.
A)સંઘર્ષ B)હતાશા C)વ્યગ્રતા D)આનંદ

275)D, 276)A, 277)A, 278)B, 279)C, 280)D, 281)C, 282)D, 283)A, 284)A, 285)B, 286)B, 287)B, 288)C, 289)A, 290)A, 291)C, 292)C, 293)C, 294)A, 295)A, 296)C, 297)C, 298)B.

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016

299. ઉચ્ચારની રીતે જુદો પડતો મુળાક્ષર કયો છે?

A)જ B)ગ C)છ D)ચ

300. નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે?

કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ

A)ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન

B)કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ

C)કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ

D)કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ

301. શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

A)કદ B)કાઠું C)માપ D)કદાવર

302. સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો.

A)આંખમાં B)અજબ C)ઝડપથી D)પરિવર્તન

303. સાચી જોડણી શોધો.

A)સુષૂમ્ણા B)ષુસૂમણા C)સુષુમણા D)સૂષુમણા

304. 'સુષ્મા' શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે?

A)સ + ઉષ્મા B)સ + ઊષ્મા C)સુ + ષમા D)સુ + સમા

305. શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે - રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.

A)દ્વિગુ B)દ્વન્દ્વ C)ઉપપદ D)કર્મધારય

306. ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો - પંકિતમાં અલંકાર કયો છે?

A)વર્ણાનુપ્રાસ B)ઉત્પ્રેક્ષા C)અનન્વય D)શ્લેષ

307. 'તબદીર' શબ્દનો અર્થ શો થાય?

A)યુકિત B)તસ્વીર C)મુકિત D)તકદીર

308. નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાકયમાં મુખ્ય કર્મ કયું છે?

A)શીખવ્યું B)મેડમે C)વિદ્યાર્થીને D)અંગ્રેજી

309. ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા' કહેવતનો અર્થ શો થાય?

A)ખાવું, પીવું અને લહેરથી મોજમજા કરવી.

B)ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો.

C)જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવરાવીને રાજી થવુ.

D)કરકસરપૂર્વક જીવન જીવવું.

310. "અક્ષર લેશન કરે છે" સાદા વાકયને પ્રેરક વાકયમાં ફેરવતાં કયું વાકય બનશે?

A)અક્ષયથી લેશન કરાય છે. B)અક્ષય લેશન કરાવશે

C)અક્ષય લેશન કરાવે છે D)અક્ષય લેશન કરશે

GPSC Class-1 - 2016

311. કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ?

A)પીઠ પાછળ નિંદા કરવી

B)ઘરની વાતો બીજાને કહેવી

C)સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે

D)દિલની વાત જણાવવી

312. રૂઢિપ્રયોગ - "માથે ઝાડ ઊગવાં"નો અર્થ શું છે ?

A)ખૂબ સમૃદ્ધ હોવું

B)બહુ દુ:ખ પડવા

C)લાંબો વખત ન ટકે એવી વસ્તુ

D)ફળદ્રુપ જમીન

313. સંધિ છૂટી પાડો - "વનૌષધિ"

A)વન્ + ઓષધિ B)વન + ઔષધિ

C)વન + ઔષધી D)વન્ + ઓષધી

314. સંધિ છૂટી પાડો - "મહોર્મિ"

A)મહા + ઊર્મિ B)મહા + ઊર્મી

C)મહા + ઉર્મિ D)મહા + ઉર્મી

315. નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ" નો વિરુદ્ધાર્થી છે ?

A)ગમ B)અધીર C)મલિન D)મ્લાન

316. નીચેના પૈકી "અક્ષત"નો સમાનાર્થી શબ્દ કયો છે ?

A)અલગ B)અવાજ C)અકબંધ D)અચાનક

317. "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ?

A)કપાસનો તાર B)સહેલું

C)આભડછેટ D)ખરાબ

318. "અંગુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ?

A)નવી ચામડી B) લીલી દ્રાક્ષ C)દેવદાર

D)નદી

319. "પંચદેવ" કયા પ્રકારનો સમાસ છે ?

A)દ્વિગુ સમાસ B)તત્પુરુષ સમાસ

C)મધ્યમપદલોપી સમાસ D)ઉપપદ સમાસ

320. "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ?

A)ઉપપદ સમાસ B)અવ્યયીભાવ સમાસ

C)કર્મધરાય સમાસ D)દ્વન્દ્વ સમાસ

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

321. "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ?

A)ઉપપદ B)કર્મધારય C)તત્પુરુષ D)અવ્યયીભાવ

322. "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ?

A)દ્વિગુ B)બહુવ્રીહિ C)મધ્યમપદલોપી D)કર્મધારય

299)B, 300)C, 301)B, 302)C, 303)C, 304)D, 305)A, 306)A, 307)A, 308)D, 309)C, 310)C, 311)C, 312)B, 313)B, 314)A, 315)D, 316)C, 317)B, 318)A, 319)A, 320)B, 321)D, 322)A.

323. સંધિ છૂટી પાડો : "ઉત્તેજક"

A) ઉત્ + તેજક B) ઉતઃ + તેજક

C) ઉત + એજક D) ઉદ્ + તેજક

324. "સચરાચર"નો સમાનાર્થી શબ્દ કયો છે ?

A) વરસાદ B) વિશ્વ C) પ્રભાત D) મુસાફર

325. "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

A) સ્વાર્થમાં નજર હોવી B) જેવી સોબત તેવી અસર પડે

C) સમય ઓછો અને કામ ઘણાં D) સાવ કંગાળ હોવું

326. "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ?

A) કમળ B) સૂર્ય C) ચંદન D) મોગરો

327. "પ્રબુદ્ધ"નો વિરુધ્ધાર્થી શબ્દ કયો છે ?

A) સમજુ B) સતેજ C) જ્ઞાની D) મૂઢ

328. "પરીમિતી"ની સાચી જોડણી કઈ છે ?

A) પરિમિતી B) પરીમિતી C) પરિમિતિ D) પરિમીતિ

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

329. સાચી જોડણી લખો - "પુતળુ"

A) પૂતળૂં B) પુતળૂં C) પુતળૂ D) પૂતળું

330. "ગુણ" શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ?

A) જાતિ સ્વભાવ B) મૂળ લક્ષણ C) થેલો D) અસર

331. આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

A) દુનિયા B) જગત C) ભૌતિક D) અધિભૌતિક

332. 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

A) અવળું સમજવું B) ખૂબ વૈભવ માણવો

C) ઓચિંતી આપત્તિ આવવી D) મન દુભાવું

GPSC Class - 2 - 18/03/2017

333. નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી.

A) વસંતતિલકા B) અનુષ્ટુપ C) વંશસ્થ D) વ્યાજ સ્તુતિ

334. નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો કયા છે?

1) ઘોડો 2) તુરંગ 3) વાજી 4) પાર્થ

A) 1 અને 2 B) 1 અને 3

C) 1, 2 અને 3 D) 1, 2, 3 અને 4

GPSC Class - 1 - 28/01/2017

335. અનુકૂળની સાચી જોડણી કઈ છે?

A) અનુકુળ B) અનૂકૂળ C) અનૂકુળ D) અનુકૂળ

336. "દૂધે મેહ વરસવા" રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે?

A) આનંદ આનંદ થઈ જવો B) યશસ્વી કાર્ય કરી બતાવવું

C) ખૂબ ગર્વ હોવો D) હાજી હા કરવી

337. વિરુધ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી?

A) સાપેક્ષ - નિરપેક્ષ B) લાભ-ગેરલાભ

C) સાધક - સાધિકા D) ક્ષણિક- શાશ્વત

નાયબ ચિટનીશ - 02/06/2015

338. 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ?

A) તત્પુરુષ B) કર્મધારય C) મધ્યમપદલોપી D) ઉપપદ

339. 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો.

A) ભયભીત B) ડરપોક C) નિર્ભય D) કાયર

340. નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે ?

A) દેશ પ્રેમ B) લાભાલાભ C) શાકભાજી D) નટવર

341. વાંચશે તો પાસ થશે - રેખાંકિત પદ શું છે ?

A) વિશેષણ B) નિપાત

C) સંયોજક D) ક્રિયા વિશેષણ

342. 'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

A) શબ્દાનુપ્રાસ B) વર્ણાનુપ્રાસ

C) ઉત્પ્રેક્ષા D) વ્યતિરેક

343. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

A) નિતિ B) નીતિ C) નીતી D) નિતી

344. નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે?

A) નિર + દોષ B) નિ + દોષ

C) નિઃ + દોષ D) નીઃ + દોષ

345. નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ?

A) ઝાડ B) ઝુમખું C) ગાંધીજી D) પ્રેમ

346. કયા છંદમાં 24 માત્રા હોય છે ?

A) દોહરો B) ઝૂલણા C) ચોપાઈ D) મનહર

347. નીચે આપેલાં વાકયમાં કયો અલંકાર છે ?
વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે.

A) ઉત્પ્રેક્ષા B) રૂપક C) શ્લેષ D) સજીવારોપણ

348. સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?

A) ચૂપકિદી B) ચુપકીદી C) ચુપકીદિ D) ચૂપકીદી

349. 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

A) હાથી B) કોયલ C) જંગલ D) વનિતા

350. નીચેની પંક્તિમાં કયો અલંકાર છે ?
તું ચંદ્ર થી ચારુ સુહાસિની હે.

A) વ્યતિરેક B) શ્લેષ C) રૂપક D) ઉપમા

351. 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે?

A) જાણીતો B) ખુલ્લું C) જાહેર D) પ્રચ્છન્ન

352. 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ?

A) તત્પુરુષ B) બહુવ્રીહી C) ઉપપદ D) દ્વંદ્વ

323)D, 324)B, 325)A, 326)B, 327)D, 328)C, 329)D, 330)C, 331)D, 332)D, 333)D, 334)C, 335)D, 336)A, 337)C, 338)C, 339)C, 340)C, 341)C, 342)B, 343)B, 344)C, 345)A, 346)A, 347)D, 348)D, 349)A, 350)A, 351)D, 352)D.

353. 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
A)સમીર B)રજની C)શ્યામા D)વલ્લભા
354. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ?
A)ચોપાઈ B)શિખરિણી C)મંદાક્રાંતા D)પૃથ્વી
355. નીચેના શબ્દસમૂહ માટે કયો શબ્દ સાચો છે?
દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ
A)તાંસળું B)ગોરસી C)કુલડી D)ઠીબરી

નાયબ ચિટનીશ - 05/02/2017

356. વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આરોહ'
A)વિદ્રોહ B)વિરહ C)અવરોહ D)પ્રરોહ
357. અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.'
A)શ્લેષ B)અનન્વય C)ઉપમા D)રૂપક
358. આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.'
A)મારો B)હાથ C)દબાવ્યો D)તેણે
359. રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ફના થવું'
A)ગુસ્સે થવું B)પાયમાલ થવું
C)રીસાઈ જવું D)પ્રસન્ન થવું
360. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે?
A)વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય B)વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય
C)વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ D)વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ
361. સંયોજકનો પ્રકાર લખો : 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'
A)અવતરણવાચક B)વિકલ્પવાચક
C)સમુચ્ચયવાચક D)શરતવાચક
362. સમાસ ઓળખાવો : હિંદવાસી
A)તત્પુરુષ B)દ્વન્દ્વ
C)મધ્યમપદલોપી D)દ્વિગુ
363. સંધિ લખો : ઉચ્ચાર
A)ઉ + ચાર B)ઉદ્ + ચાર
C)ઉચ્ચ + આર D)ઉર્ + ચાર
364. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો : 'સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું'
A)દૃષ્ટા B)ત્રિકાળદર્શી C)સ્પષ્ટ D)સ્પંદ
365. રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : 'સૈનિકની <u>ટુકડી</u> નગરમાં પ્રવેશી'
A)જાતિવાચક B)સમૂહવાચક
C)ભાવવાચક D)વ્યક્તિવાચક
366. સમાસ ઓળખાવો : 'કમલાક્ષી'
A)દ્વન્દ્વ B)દ્વિગુ C)તત્પુરુષ D)બહુવ્રીહી
367. નિપાત લખો : 'વન તો કલ્પના સમાન બની જશે.'
A)તો B)સમાન C)કલ્પના D)વન
368. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ટચલી આંગળી પાસેની આંગળી'
A)પ્રથમા B)મધ્યમા C)અનામિકા D)તર્જની
369. રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો'
A)રોકકળ કરવી B)ગજનું રજ કરવું
C)રજનું ગજ કરવું D)બુમરાણ કરવી
370. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
A)પશ્ચાત્તાપ B)પ્રશ્ચાતાપ C)પ્રશ્ચાત્તાપ D)પશ્ચાતાપ
371. નીચેના પૈકી કયું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ?
A)હય - હાથી B)શરટ - કાગડો
C)વિયતિ - બ્રહ્મા D)વૃંદા - તુલસી
372. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
A)મુદ્ગલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર B)મુદ્ગલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર
C)મંત્ર, મુગ્ધ, મુદ્ગલ, મુહૂર્ત D)મંત્ર, મુદ્ગલ, મુહૂર્ત, મુગ્ધ
373. નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.'
A)પણ B)હાજરી C)છું D)હું
374. સંધિ લખો : પુનર્ + અવતાર
A)પુનરવતાર B)પુર્નઅવતાર C)પુનર્વતાર D)પુનવતાર
375. અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.'
A)વર્ણાનુંપ્રાસ B)રૂપક C)ઉત્પ્રેક્ષા D)ઉપમા
376. વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ'
A)દૃષ્ટિ B)સમષ્ટિ C)સૃષ્ટિ D)કષ્ટિ
377. રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું'
A)વિસરાઈ જવું B)માફ કરવું
C)બેધ્યાન રહેવું D)ખોટ પૂરવી
378. છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.'
A)સ્રગ્ધરા B)ચોપાઈ C)મનહર D)શાર્દૂલવિક્રીડિત
379. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
A)અર્ધનીમિલિત B)અર્ધનિમીલીત
C)અર્ધનીમિલીત D)અર્ધનિમીલિત
380. છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.'
A)પૃથ્વી B)શિખરિણી C)મંદાક્રાન્તા D) વસંતતિલકા
381. કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'
A)નખ આંગળી સાથે જોડાતા નથી.
B)પારકાં પોતાનાં ન બને.
C)પોતાનાં પારકાં ન બને.
D)આંગળીમાં નખ વધે છે.
382. સમાનાર્થી શબ્દ લખો : 'ધરતી'
A)પ્રથમી B)વિપિન C)વાલુકા D)સવિતા
383. આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.'
A)પક્ષીઓ B)છે C)ઊડે D)નાનાંમોટાં

353)B, 354)A, 355)B, 356)C, 357)C, 358)A, 359)B, 360)D, 361)C, 362)A, 363)B, 364)C, 365)B, 366)D, 367)A, 368)C, 369)C, 370)A, 371)D, 372)C, 373)A, 374)A, 375)B, 376)B, 377)B, 378)A, 379)D, 380)D, 381)B, 382)A, 383)D.

GPSC Class - 2 - 18/03/2017

384. નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
A)ગુણીભૂત B)ગૂણીભૂત C)ગુણિભુત D)ગુણીભુત

385. સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ?
A)સૂરજ B)અવાજ C)દેવ D)ધ્વનિ

386. તુમડીના કાંકરા-રૂઢિ પ્રયોગનો સાચો અર્થ કયો છે ?
A)વગર મહેનતે વિઘ્ન ટળવું B)પડતી આવવી
C)તંગી હોવી D)સમજી ન શકાય તેવી વાત

387. નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
A)સૂસણીયુ B)સૂસણિયું C)સુસણિયું D)સુસણિયુ

388. "ઊને પાણીએ ઘર ન બળે" એ કહેવતનો સાચો અર્થ કયો છે?
A)કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
B)મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
C)ધીરજથી કામ સારું થાય.
D)થોડું થોડું કરતાં મોટું કામ થાય.

389. "નાકની દાંડી સામે આંખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ?
A)પ્રમાણિક રહેવું B)સીધે રસ્તે જવું
C)સામે મોંએ જવું D)સીધો કે ધોરી માર્ગ

390. "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે?
A)વિશ્વાસઘાત કરવો B) પીડા વળગાડવી, જંજાળમાં પડવું
C)સમ ખાવા D)ગળું રૂંધાવું

GPSC Class - 2 - 11/12/2016

391. યોગ્ય જોડણી જણાવો. વિલીનીકરણ
A)વીલીનીકરણ B)વિલીનીકરણ
C)વિલિનિકરણ D)વિલીનિકરણ

392. ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ
અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ - આ શબ્દસમુહને શું કહે છે ?
A)મુક્તક B)દુહા C) હાઈકુ D) ટુચકા

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

393. નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?
A) દિક્કાલ-તત્પુરુષ B) દુઃખ વિયોગ - મધ્યમપદલોપી
C) ત્રિકાલ - બહુવ્રીહિ D) મડાગાંઠ - કર્મધારય

394. નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ?
A) જકાતનાકું-મધ્યમપદલોપી B) સોનામહોર-દ્વન્દ્વ
C) ગૌરવપ્રદ- ઉપપદ D) મહાસિદ્ધિ-કર્મધારય

395. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ
A) પ્રોષિતપત્નીક B) પ્રોષિતભર્તૃકા
C) પ્રોષિતપતિ D) પત્નીવિહોણો

396. નીચેના શબ્દસમુહ માટે એક શબ્દ આપો.
'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ'
A) શાલભંજિકા B) શાલમંજરી
C) શિરભંજિકા D) શિરશાખા

397. ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
A) ઉપમા B) ઉત્પ્રેક્ષા C) રૂપક D) વ્યતિરેક

398. 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' - પંક્તિનો છંદ જણાવો.
A) પૃથ્વી B) શિખરિણી C) મંદાક્રાંતા D) હરિગીત

399. નીચેમાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?
A) જસજસયલગા B) યમનસભલગા
C) મસજસતતગા D) મરભનયયય

400. 'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ?
A) ધૂળ કાઢી નાખવી B) લોહીનું પાણી કરવું
C) લોઢાના ચણા ચાવવા D) નાકે દમ આવી જવો

401. 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શો અર્થ થાય ?
A) સ્થિતિ બદલાઈ જવી B) નિષ્ફળતા મળવી
C) ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી
D) બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી

402. 'જડમૂળથી ઉખેડી નાખવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
A) ઝાડના મૂળિયા નાશ પામવા
B) ઝાડના મૂળિયા ખેંચી નાખવા
C) સમૂળગો નાશ કરવો
D) ઝાડના મૂળિયાને રગદી નાખવા

403. 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ?
A) ખાળે ડૂચા ને દરવાજા મોકળા B) પેટનો બળ્યો ગામ બાળે
C) ડૂબતો માણસ તરણું પકડે D) ખાલી ચણો વાગે ઘણો

404. નીચેનામાંથી કયું સમાનાર્થી જોડકું ખોટું છે ?
A) બળદ- સુરભિસુત-આખલો B) ભોરંગ-વાસુકિ-સર્પ
C) હાથી-ગજ-હસ્તિ D) શાર્દૂલ-મહિષી-મર્કટ

405. 'ઉછંગ'નો સાચો પર્યાય લખો.
A) પુષ્કળ B) ખોળો C) ચિનગારી D) મૃદુલ

384)A, 385)C, 386)D, 387)C, 388)B, 389)A, 390)B, 391)B, 392)B, 393)D, 394)B, 395)A, 396)A, 397)C, 398)B, 399)C, 400)A, 401)C, 402)C, 403)D, 404)D, 405)B,

406. નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે?
A) તેંતબારી-નજીક B) વરતવું-ઓળખવું
C) વટે-ઓળંગે D) વેળા-વળવું

407. નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકા પૈકી કયો વિકલ્પ સાચો છે?
A) અનભે-રૂવાંડે B) પેઠે-સાંજે C) રાસ-મેળ D) નથ-સ્પષ્ટ

408. ડોશા વાડી ખેતરમાં કામ કરે છે.- રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ?
A) સપ્તમી B) ચતુર્થી C) ષષ્ઠી D) પ્રથમા

409. નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, 'માધ્યમ કે કારણ દર્શાવે છે ?
A) તૃતીયા વિભક્તિ B) પ્રથમા વિભક્તિ
C) દ્વિતીયા વિભક્તિ D) ચતુર્થી વિભક્તિ

410. નીચેનામાંથી ક્યું વાક્ય નિપાતવાળું છે ?
A) એ અને રોશની આવ્યા પણ ખરા.
B) રોશની આવી પણ એ ન આવી.
C) તમે આવો તો વાત કઈ જામે.
D) માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.

411. નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો.
A) તેણે દાખલા ગણાવડાવ્યા B) તેને બધાં દાખલા ગણવા પડશે
C) તેણે બધા દાખલા ગણ્યા D) તે બધા દાખલા ગણશે

412. ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ?
A) પુનઃપ્રેરક B) કર્મણી C) ભાવે D) કર્તરિ

PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017

413. સાચી જોડણી જણાવો.
A) વિપરિત B) વિપરીત C) વીપરીત D) વીપરિત

414. સાચી જોડણી જણાવો.
A) વાલ્મીકિ B) વાલ્મીકી C) વાલ્મિકી D) વાલ્મિકી

415. 'સ્પૃહા' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) કારણ B) ફિકર C) ઈચ્છા D) ચિંતા

416. 'કેતુ' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) ધજા B) હેતુ C) ઘર D) અવાજ

417. 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) આપત્તિ B) સ્વજન C) મિત્ર D) નદી

418. ઘણી બુમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) અસંગત B) અરણ્યરુદન C) અસાધ્ય D) અધ્યાત્મ

419. જેનો એકપણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) નિઃસંતાન B) અખોવન C) રામબાણ D) અવિભાજ્ય

420. 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો.
A) વ્યં + જન B) વી + અંજન C) વિ + અંજન D) વ્ય + અંજન

421. 'તેણે મોટેથી બૂમ પાડી'- વાક્યનો પ્રકાર જણાવો.
A) કર્મણિ B) કર્તરિ C) ભાવે D) પ્રેરક

422. 'સૂર પૂરવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
A) ગીત ગાવું B) સંગીત વગાડવું
C) હામાં હા કહેવી D) આનાકાની કરવી

423. 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
A) દુઃખ થવું B) મંદબુદ્ધિ હોવું
C) આનંદ થવો D) નિરાંત થવી

424. 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
A) ગાય B) બળદ C) ભેંસ D) ઢોર

425. 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો.
A) વિદ્યા + અર્થી B) વિદ્ય + અર્થી
C) વિદ્ય + આર્થી D) વિદ્યા + આર્થી

426. 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.
A) સિન્ધુ + ઊર્મિ B) સિન્ધુ + ઊર્મિ
C) સિન્ધૂ + ઊર્મિ D) સિન્ધુ + ઊર્મિ

427. 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો.
A) ષડ્ + યંત્ર B) ષડ + યંત્ર C) ષટ્ + યંત્ર D) ષટ + યંત્ર

428. 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો.
A) સુ + ષમા B) સુ + ષ્મા C) સુ + સમા D) સુ + સ્મા

429. સાચી જોડણી જણાવો.
A) પ્રતિતિ B) પ્રતીતી C) પ્રતિતી D) પ્રતીતિ

430. 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો.
A) વર્ણાનુપ્રાસ B) આંતરપ્રાસ C) અંત્યાનુપ્રાસ D) શ્લેષ

431. સાચી જોડણી જણાવો.
A) ચર્તુભુજ B) ચતુર્ભુજ C) ચર્તુભૂજ D) ચતુર્ભૂજ

432. 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
A) મિત્ર B) સ્વજન C) દુશ્મન D) પિતા

433. 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
A) વરસાદ B) નદી C) દરિયો D) તળાવ

434. 'વિના વાંકે એવો મુજ હૃદયને કોપ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે?
A) શિખરિણી B) પૃથ્વી C) હરિગીતા D) ભુજંગી

435. 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
A) કઠણ B) મૃદુ C) લિસ્સુ D) ખરબચડું

436. 'ને પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો.
A) મંદાક્રાંતા B) શિખરિણી C) વસંતતિલકા D) મનહર

437. 'અપ્સરા તો અપ્સરા જ ને!' - આ વિધાનમાં કયો અલંકાર છે?
A) રૂપક B) વ્યતિરેક C) વ્યાજસ્તુતિ D) અનન્વય

438. સાચી જોડણી જણાવો.
A) પરીતોષ B) પરીતોસ C) પરિતોષ D) પરીતોશ

439. 'આતુર થવું' માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?
A) તલપાપડ થઈ રહેવું B) તાસીરો બોલી રહેવો
C) કળ વળવી D) અછોવાના કરવાં

406)D, 407)B, 408)A, 409)A, 410)A, 411)A, 412)A, 413)B, 414)A, 415)C, 416)A, 417)D, 418)B, 419)B, 420)C, 421)B, 422)C, 423)D, 424)B, 425)A, 426)D, 427)C, 428)C, 429)D, 430)A, 431)B, 432)C, 433)D, 434)A, 435)B, 436)A, 437)D, 438)C, 439)A.

440. 'કૌમુદી' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) કૂંપળ B) ચાંદની C) રાત્રિ D) ડાળી

441. 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો.
A) કર્મધારય B) દ્વન્દ્વ C) બહુવ્રીહિ D) મધ્યમપદલોપી

442. 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) ધુમ્મસ B) વાદળ C) આકાશ D) વરસાદ

443. સાચી જોડણી જણાવો.
A) વિખૂટું B) વીખૂટું C) વિખૂટૂં D) વિખુટૂં

444. નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ?
A) ટપટપ B) ચા-બા
C) વાસણ બાસણ D) પાણી બાણી

445. 'ઉદગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે'- પંક્તિનો છંદ ઓળખો.
A) અનુષ્ટુપ B) ઉપજાતિ C) વસંતતિલકા D) શિખરિણી

446. 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો.
A) તીર્થ + ઊત્તમ B) તીર્થો + ત્તમ
C) તીર્થ + ઉત્તમ D) તીર્થો + ઊત્તમ

447. 'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) ઝરણું B) રણ C) પર્વત D) દરિયો

448. 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) શાકભાજી B) કરિયાણું C) સામાન D) ઉકરડો

449. 'જેની બુદ્ધિ સ્થિર છે તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) નિઃસ્પૃહા B) સ્થિતપ્રજ્ઞ C) ચલિત પ્રજ્ઞા D) મંદમતિ

450. સાચી જોડણી જણાવો.
A) પરિવેષ B) પરિવેશ C) પરિવેસ D) પરીવેષ

451. 'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) ઈન્દ્ર B) ગણપતિ C) મહાદેવ D) કામદેવ

452. 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો.
A) અભિઅંતર B) અભિંતર C) અભ્યંતર D) અભ્યંતરં

453. 'ઘોડાગાડી' શબ્દનો સમાસ જણાવો.
A) મધ્યમપદલોપી B) દ્વિગુ C) કર્મધારય D) દ્વન્દ્વ

454. 'તમારે માત્ર દસ વખત લખવાનું છે.' - વિધાનમાં 'માત્ર' શું દર્શાવે છે ?
A) અનુગ B) વિભક્તિ C) નિપાત D) પ્રત્યય

455. 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો.
A) રૂપક B) અનન્વય C) અપહનુતિ D) ઉત્પ્રેક્ષા

456. 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો.
A) ઉત્પ્રેક્ષા B) યમક C) શ્લેષ D) રૂપક

457. 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો.
A) વ્યતિરેક B) શ્લેષ C) યમક D) ઉપમા

458. 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો.
A) શિખરિણી B) વસંતતિલકા C) મંદાક્રાંતા D) સ્રગ્ધરા

459. 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો.
A) શિખરિણી B) અનુષ્ટુપ C) હરિગીત D) મંદાક્રાંતા

460. 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો.
A) પૃથ્વી B) હરિગીત C) માલિની D) મિશ્રોપજાતિ

461. 'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો.
A) સ્રગ્ધરા B) હરિગીત C) મંદાક્રાંતા D) શિખરિણી

462. 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો.
A) સ્રગ્ધરા B) અનુષ્ટુપ C) હરિણી D) શાર્દૂલવિક્રીડિત

463. મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે ?
A) 30 B) 32 C) 33 D) 31

464. અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ?
A) આઠ B) ચાર C) ત્રણ D) બે

465. ચોપાઈ છંદમાં કેટલી માત્રા હોય છે ?
A) પંદર B) સોળ C) ચૌદ D) તેર

466. 'જે પોષતું, તે મારતું શું એ નથી ક્રમ કુદરતી' - પંક્તિનો છંદ ઓળખાવો.
A) હરિગીત B) ઝૂલણાં C) દોહરો D) સવૈયા

467. 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો.
A) હરિગીત B) મનહર C) મંદાક્રાંતા D) પૃથ્વી

468. રૂઢિપ્રયોગ ઓળખી બતાવો.
A) ઝાઝા હાથ રળિયામણા. B) અધૂરો ઘડો છલકાય.
C) ઉતાવળે આંબા ન પાકે. D) હળવા ફૂલ થઈ જવું.

469. કહેવત ઓળખી બતાવો.
A) ભીંત ભૂલવી B) ગળથૂથીમાં મળવું
C) જીવ હેઠો બેસવો D) ખાલી ચણો વાગે ઘણો

470. 'વપુ' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) શરીર B) માથું C) હાથ D) પગ

471. 'દ્યુતિ' શબ્દનો પર્યાયવાચી જણાવો.
A) વીજળી B) નદી C) હવા D) તેજ

472. 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ?
A) દૂર્વા B) રૂપક C) રોમ D) દ્રુમ

473. 'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કચલાં' - પંક્તિનો અલંકાર જણાવો.
A) ઉત્પ્રેક્ષા B) રૂપક C) ઉપમા D) વ્યતિરેક

474. 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ?
A) કુંજર B) હસ્થ C) કંથ D) મૃગેશ

475. 'નિષેધાજ્ઞા' શબ્દની સંધિ છૂટી પાડો.
A) નિષેધા + જ્ઞા B) નિષેધ + આજ્ઞા
C) નિષેધા + આજ્ઞા D) નિષે + ધાજ્ઞા

440)B, 441)B, 442)D, 443)A, 444)A, 445)C, 446)C, 447)D, 448)A, 449)B, 450)B, 451)D, 452)C, 453)A, 454)C, 455)A, 456)A, 457)B, 458)A, 459)D, 460)A, 461)A, 462)D, 463)D, 464)B, 465)A, 466)A, 467)D, 468)D, 469)D, 470)A, 471)D, 472)D, 473)A, 474)A, 475)B.

476. 'સોપારી' માટે નીચેનામાંથી ક્યો પર્યાય સાચો છે ?
A) શ્રીફળ B) ફોફળ C) તાંબુલ D) રેણુ

477. 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો.
A) મંદાક્રાંતા B) સ્ત્રગ્ધરા C) પૃથ્વી D) હરિણી

478. નીચેનામાંથી ક્યો છંદ 17 અક્ષરનો નથી ?
A) હરિણી B) પૃથ્વી C) મંદાક્રાંતા D) વસંતતિલકા

479. 'સખી' શબ્દ માટે નીચેનામાંથી ક્યો પર્યાય સાચો છે ?
A) સૌમ્ય B) અલિ C) અલી D) ભાર્યા

480. 'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી'- પંક્તિનો છંદ ઓળખાવો.
A) પૃથ્વી B) અનુષ્ટુપ C) હરિણી D) શિખરિણી

481. 'નવરાત્રિ' શબ્દનો સમાસ જણાવો.
A) બહુવ્રીહિ B) દ્વિગુ
C) મધ્યમપદલોપી D) કર્મધારય

482. 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો.
A) મધ્યમપદલોપી B) અવ્યયીભાવ
C) ઉપપદ D) બહુવ્રીહિ

483. 'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો.
A) ચતુર્પદી B) ચતુરૂપદી C) ચતુષ્પદી D) ચતુસ્પદી

484. સાચી જોડણી જણાવો.
A) પ્રલ્હાદ B) પ્રલ્હાદ C) પ્રહલાદ D) પ્રહ્લાદ

485. ખોટી જોડણી જણાવો.
A) વિકરાળ B) ઊજાગરો C) બિલકુલ D) નિમણૂક

486. ખોટી જોડણી જણાવો.
A) પિપૂડું B) કામિયો C) સુરીલું D) ફૂદીનો

487. નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો.
A) સૂડી વચ્ચે સોપારી B) મા વિના સૂનો સંસાર
C) ઝીણો પણ રાઈનો દાણો D) બોચી પર કાંકરો મૂકવો

488. 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે?
A) અવતરણ B) અર્ધવિરામ C) લોપચિહ્ન D) આશ્ચર્યચિહ્ન

489. નીચેનામા શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો.
A) બે B) તીખું C) પંદર D) પચાસ

490. 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) મરુભૂમિ B) ખારો પ્રદેશ C) ઉષ્ણ પ્રદેશ D) શીત પ્રદેશ

491. 'પથ્થર થરથર ધ્રૂજે' પંક્તિમાં ક્યો અલંકાર છે ?
A) ઉત્પ્રેક્ષા B) રૂપક C) ઉપમા D) સજીવારોપણ

492. 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો.
A) સાદું વાક્ય B) સંકુલ વાક્ય
C) સંયુક્ત વાક્ય D) નિષેધ વાક્ય

493. 'સંકલ્પ' શબ્દની સંધિ છૂટી પાડો.
A) સં + કલ્પ B) સમ્ + કલ્પ C) સમ + કલ્પ D) સમ + ક્લ્પ

494. 'ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં ક્યો અલંકાર છે ?
A) વ્યાજસ્તુતિ B) અનન્વય
C) અતિશયોક્તિ D) વ્યતિરેક

495. સાચી જોડણી જણાવો.
A) આંબાવાડિયું B) આબાંવાડિયું
C) આંબાવાડીયું D) આબાંવાડીયું

496. સાચી જોડણી જણાવો.
A) ઉદ્યોગીકરણ B) ઔદ્યોગીકરણ
C) ઔદ્યોગિકરણ D) ઉદ્યોગિકીકરણ

497. 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી'- આ વિધાનના ક્યા પદમાં ભૂલ છે ?
A) બાવાઓએ B) ફરતે C) પાવાગઢની D) પ્રદક્ષિણા

498. નીચેનામાંથી ક્યો શબ્દ શુદ્ધ છે ?
A) મંઝિલ B) અંતર્ધ્યાન C) મહત્ત્વ D) પરિણિત

499. 'ત, ભ, જ, જ, ગાગા' ક્યા છંદનું બંધારણ છે ?
A) મંદાક્રાંતા B) અનુષ્ટુપ C) વસંતતિલકા D) હરિણી

500. 31 માત્રાનો છંદ ક્યો છે ?
A) સવૈયા B) મનહર C) અનુષ્ટુપ D) હરિણી

501. નીચેનામાંથી ક્યો સમાસ દ્વિગુ નથી ?
A) નવનિધિ B) ત્રિશૂળ C) ત્રિભુવન D) સમયસર

502. સાચી જોડણી જણાવો.
A) તિલાંજલિ B) તિલાંજલી C) તીલાંજલી D) તીલાંજલિ

503. 'વાકુચૂકુ' શબ્દમાં અનુસ્વાર ક્યા અક્ષર પર આવશે ?
A) વા B) કુ, કુ
C) ચૂ D) ચારે અક્ષર પર

504. સાચી જોડણી જણાવો.
A) અભીભૂત B) અભિભૂત C) અભીભુત D) અભિભુત

505. નીચેનામાંથી ક્યો શબ્દ 'પવન'નો પર્યાયવાચી નથી ?
A) સમીર B) અનિલ C) વાયુ D) સ્વ

506. નીચેનામાંથી ક્યો શબ્દ 'આંખ'નો પર્યાયવાચી નથી ?
A) નેત્ર B) નયન C) વ્યોમ D) ચક્ષુ

507. 'કામના', 'એષણા', 'મનોરથ' માટે ક્યો પર્યાય યોગ્ય છે ?
A) સ્પૃહા B) તહોમત C) અદ્વિતીય D) મારુત

508. 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે ક્યો પર્યાય યોગ્ય છે ?
A) પુત્રી B) પુત્ર C) સ્વજન D) પિતા

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

509. 'નિષ્કામ' શબ્દની સંધી છૂટી પાડો.
A) નિષ + કામ B) નિઃ + કામ
C) નિશ્ + કામ D) નિસ્ + કામ

476)B, 477)A, 478)D, 479)C, 480)A, 481)B, 482)C, 483)C, 484)D, 485)B, 486)D, 487)D, 488)C, 489)B, 490)A, 491)D, 492)B, 493)B, 494)A, 495)A, 496)C, 497)B, 498)C, 499)C, 500)A, 501)D, 502)A, 503)D, 504)B, 505)D, 506)C, 507)A, 508)B, 509)D.

510. 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

A) દ્વિતીયા B) તૃતીયા C) ચતુર્થી D) પ્રથમા

511. 'મક્ષિકા' એટલે શું ?

A) માખી B) મોક્ષ C) જન્માક્ષર D) માટલી

512. 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ?

A) ભીખુ B) જીવનપાથેય C) બાનોવાડો D) પરીક્ષા

513. 'માતાપિતા' સમાસ ઓળખાવો.

A) તત્પુરુષ સમાસ B) કર્મધારય સમાસ
C) ઉપપદ D) દ્વન્દ્વ સમાસ

514. 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

A) દ્વિતીયા B) ષષ્ઠી C) સપ્તમી D) ચતુર્થી

515. હટાણું-એટલે ?

A) ખરીદી B) સંધ્યાકાળ C) વસાણું D) વગોવણી

516. 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો.

A) અતિ + અન્ત B) અતી + અન્ત
C) અત્ય + ન્ત D) અત્ય + અન્ત

517. 'માનસસેવા' સમાસ ઓળખાવો.

A) તત્પુરુષ સમાસ B) કર્મધારય સમાસ
C) ઉપપદ D) દ્વન્દ્વ સમાસ

518. 'વિવેકાનંદ'સંધિ છૂટી પાડો.

A) વિવેક + અનંદ B) વિવેક + આનંદ
C) વિવેકા + અનંદ D) વિવેકા + આનંદ

519. 'તમને ભગવાને ઘણું ધન આપ્યું.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ?

A) ધન B) ને C) તમને D) ઘણું

520. 'મશક' એટલે શું ?

A) પાણી ભરવાનું ચામડાનું સાધન
B) માથું, મસ્તક
C) ઘડો D) માખણ - મસકો

521. 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો.

A) સાચવી B) તો C) અમે D) લોટો

522. 'સાવરણીથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ?

A) એણે B) ચોક C) એક પણ નહીં D) થી

523. 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો.

A) વિદ્યાત્તેજક B) વિદ્યઉત્તેજક
C) વિદ્યોત્તેજક D) વિદ્યાઉત્તેજક

524. 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ?

A) દ્વિતીયા B) તૃતીયા C) ચતુર્થી D) પ્રથમા

525. 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' રેખાંકિત શબ્દ શું છે ?

A) વિભક્તિ B) નિપાત C) ક્રિયાપદ D) સંયોજક

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

526. 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

A) આનાકાની કરવી B) અસત્યનું આચરણ કરવું
C) વિજય મેળવવો D) વધારી વધારીને બોલવું

527. 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ?

A) સંજ્ઞા B) નિપાત C) અનુગ D) નામયોગી

528. 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

A) ચડતી-પડતીનો અનુભવ કરવો B) વનનું નિરીક્ષણ કરવું
C) નબળી સ્થિતિ હોવી D) વેલનું નિરીક્ષણ કરવું

529. નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ?

A) ઝૂલણા B) વસંતતિલકા C) કટાવ D) સ્રગ્ધરા

530. અધસ્ + ગતિ = ...

A) અધોગતિ B) અધગતિ C) અધોગતિ D) અધસ્‌ગતિ

531. 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો.

A) અનુષ્ટુપ B) મંદાક્રાન્તા C) શિખરિણી D) પૃથ્વી

532. 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો.

A) શ્લેષ B) ઉપમા C) વ્યતિરેક D) અતિશયોક્તિ

533. ' : '- આ વિરામચિહ્નને શું કહેવાય ?

A) પૂર્ણવિરામ B) અર્ધવિરામ C) અલ્પવિરામ D) ગુરુવિરામ

534. શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ?

A) સાલિયાણું B) સરપાવ C) પારિતોષિક D) ઈનામ

535. આદર સૂચક નિપાત કયો છે ?

A) પણ B) જી C) જ D) તો

536. 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો.

A) પ્રસૂન B) ઈન્દુ C) ભાનુ D) અંબુ

537. 'લાભાલાભ' એ કયો સમાસ છે ?

A) અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં
B) ઈતરેતર દ્વન્દ્વ
C) સમાહાર દ્વન્દ્વ D) વૈકલ્પિક દ્વન્દ્વ

538. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?

A) પૌરસ્ત્ય B) પાશ્ચિમાત્ય C) પાશ્ચાત્ય D) પૌર્વાત્ય

539. 'ન્યૂનતા'ની સંધિ છોડો.

A) ન્યૂ + અનતા B) નિ + ઊનતા
C) ની + ઉનતા D) નૂ + ઉનતા

540. 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

A) કારણવાચક B) સમુચ્ચયવાચક
C) પર્યાયવાચક D) દ્રષ્ટાંતવાચક

510)B, 511)A, 512)A, 513)D, 514)C, 515)A, 516)A, 517)A, 518)B, 519)B, 520)A, 521)B, 522)D, 523)C, 524)A, 525)B, 526)D, 527)B, 528)A, 529)D, 530)C, 531)B, 532)A, 533)D, 534)B, 535)B, 536)B, 537)C, 538)C, 539)B, 540)C.

541. 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ?
A) મોટું પરાક્રમ કરવું B) બળતામાં ઘી હોમવું
C) મુશ્કેલીમાં વધારો થવો D) પ્રપંચ કરવો

542. ષષ્ + આનન = ...
A) ષષ્નાન B) ષષાનન C) ષશાનન D) ષડાનન

543. 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો.
A) વખાણ B) શ્રુતિ C) નિંદા D) કૂથલી

544. 'તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - ક્યો અલંકાર છે ?
A) વ્યાજસ્તુતિ B) ઉપમા C) ઉત્પ્રેક્ષા D) રૂપક

545. 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ?
A) દ્રવ્યવાચક B) વ્યક્તિવાચક C) સમૂહવાચક D) જાતિવાચક

546. 'બાંધણ છોડવા'નો અર્થ જણાવો.
A) નમતું જોખવું B) બંધન છૂટવા
C) બંધન તોડવા D) ઝઘડો થવો

547. 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.
A) વ્યતિરેક B) ઉપમા C) રૂપક D) ઉત્પ્રેક્ષા

548. 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો.
A) વસંતતિલકા B) મંદાક્રાન્તા C) પૃથ્વી
D) શિખરિણી

549. 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો.
A) બીભત્સ B) રૌદ્ર C) અરમ્ય D) સુરમ્ય

550. 'તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો.
A) ભાવવાચક B) જાતિવાચક C) સમૂહવાચક D) દ્રવ્યવાચક

551. 'ઉદ્‌ગ્રીવ' શબ્દનો સમાસ જણાવો.
A) તત્પુરુષ B) બહુવ્રીહિ C) ઉપપદ D) અવ્યયી

552. 'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો', - અલંકાર જણાવો.
A) વ્યતિરેક B) ઉપમા C) વ્યાજસ્તુતિ D) અનન્વય

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

553. નીચેનાનો અલંકાર ઓળખી બતાવો -
દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
A) અર્થાલંકાર B) શબ્દાનુપ્રાસ C) પ્રાસાનુપ્રાસ D) એકેય નહીં

554. સંધિ છૂટી પાડો - લાભાલાભ
A) લાભ + લાભ B) લાભ + અલાભ
C) લાભા + લાભ D) એકેય નહીં

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

555. "ઇચ્છા કરવા યોગ્ય" શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) ઈચ્છુક B) સ્પૃહા C) સરાહનીય D) સ્પૃહણીય

556. કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
A) અટકી - અટકીને બોલવું B) મોટેથી બોલવું
C) સતત બોલવું D) અટક્યા વગર બોલવું

557. વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો.
A) પૂર્વજ - અનુજ B) શુભ - નિર્મળ
C) ઉદ્યમી - પ્રમાદી D) વીજળી - દામિની

558. તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?
A) હરવર - હલચલ B) સરસાઈ - ચઢિયાતાપણું
C) આણીપા - આ બાજુ D) છાક - નશો

559. 'કરાલ' શબ્દ નો સમાનાર્થી જણાવો.
A) વેરી B) ઘોર C) ગાઢ D) ભયંકર

560. બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) ભોગર B) ભોગળ C) કમાન D) દંડો

561. ભૂખ્યાંજનો અને ગરીબોને સદાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) દાન B) દક્ષિણા C) સહાય D) સદાવ્રત

562. સાચી જોડણી શોધો.
A) પ્રોષિતભરતૃકા B) પ્રોશિતભતૃકા
C) પ્રોષિતભર્તૃકા D) પ્રોષીતભતૃકા

563. નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
નિશા
A) નિશા B) યામિની C) દામિની D) તટિની

564. વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો.
A) વિનોદ - હાસ્ય B) હર્ષ - ખુશી
C) હર્ષ - શોક D) આનંદિત -પુલકિત

GSSSB મિકેનિક - 2017

565. નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.
ઝાલવું.
A) પકવવું B) ઝાલેલુ C) પકડવું D) પકડેલ

566. નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર
A) બલિદાન B) શહીદ C) આહુતિ D) શહાદત

567. ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ?
A) દેવાધિ B) વેદાંતી C) સારસ્વત D) માર્મિક

568. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
A) જડિબુટ્ટી B) જડીબુટ્ટી C) જડીબુદ્ધિ D) જડીબુટી

569. નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
ખુવાર થવું
A) ગુસ્સે થવું B) પાયમાલ થવું
C) માલામાલ થવું D) ક્રોધીત થવું

541)C, 542)D, 543)A, 544)D, 545)D, 546)A, 547)C, 548)A, 549)B, 550)D, 551)B, 552)D, 553)A, 554)B, 555)D, 556)D, 557)C, 558)A, 559)D, 560)B, 561)D, 562)C, 563)B, 564)C, 565)C, 566)B, 567)B, 568)B, 569)B.

570. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

A)કુસમ x સુમન B)ભમરો x મધુકર
C)સુવાસ x દુર્ગંધ D)સુંદર x રમણીય

571. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
ધૈર્ય

A)ધીરતા B)સબૂરી C)ખામોશ D)શ્રદ્ધા

572. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.
ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી.

A)પ્રમાણે B)પણ C)ટ્રેન D)નથી

573. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
મારી ઉંમર પ્રશ્નો <u>પુછવા</u> જેટલી થઈ.

A)વિધ્યર્થકૃદંત B)ભૂતકૃદંત
C)સંબંધક ભૂતકૃદંત D)ભવિષ્યકૃદંત

574. 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો.

A)તત્પુરુષ B)બહુવ્રીહી C)કર્મધારય D)ઉપપદ

GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર - 7/5/2017

575. ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે ક્યો અલંકાર બને છે ?

A)રૂપક B)ઉત્પ્રેક્ષા C)વ્યાજસ્તુતિ D)વ્યતિરેક

576. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.
પ્રતિ + એક

A)પ્રતિએક B)પ્રતયેક C)પ્રત્યેક D)પતાકા

577. છંદ જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો

A)પૃથ્વી B)શિખરિણી C)મંદાક્રાન્તા D)અનુષ્ટુપ

578. નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.

A)આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો.
B)આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો.
C)આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો.
D)આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો.

579. નીચે આપેલા વાક્યોમાંથી 'નિપાત' શોધીને લખો.
હવે એક જ ઉપાય છે

A)એક B)ઉપાય C)જ D)છે

580. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
પૂરીઓ <u>વણતા વણતા</u> મેં કહ્યું.

A)ભૂતકૃદંત B)વર્તમાનકૃદંત
C)ભવિષ્યકૃદંત D)હેત્વર્થકૃદંત

581. 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.

A)કર્મધારય B)મધ્યમપદલોપી
C)બહુવ્રીહિ D)ઉપપદ

582. નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.
માહેલું -

A)અંદર B)માણેલું C)અંદરનું D)મળેલું

583. નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
કામ કરીને ખૂબ થાકી ગયેલી -

A)થાકેલી B)થાકીપાકી C)મજબૂર D)થાકેલ

584. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

A)ગિરિશૃંગ B)ગીરીશૃંગ C)ગિરીશૃંગ D)ગીરીશ્રુંગ

585. નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
પડો વજાડવો -

A)ઢોલ વગાડવો B)જાણ કરવી
C)ખબર પડવી D)જાહેરાત કરવી

586. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

A)આળસું x ઉદ્યમી B)ઠોઠ x નબળો
C)ઉમંગ x હર્ષ D)દેવું x કરજ

GSSSB સર્વેયર - 2016-17

587. નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો.

A)ભારવાચક B)સંશયવાચક
C)ખાતરીવાચક D)સીમાવાચક

588. 'ફૈલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.

A)નાસીપાસ B)ચેનચાળા
C)અન્યનું D)પ્રભાવશાળી

589. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

A)ચતુર્ભુજ B)ચતૂર્ભૂજ C)ચતુર્ભૂજ D)ચર્તુભુજ

590. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. - અંક વાળવો

A)અંક વળી જવો B)અંકનો વાળ ચડી જવો
C)સરહદ પાર કરવી D)હદ થવી

591. ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે ક્યો અલંકાર બને છે ?

A)ઉત્પ્રેક્ષા B)રૂપક C)વ્યતિરેક D)ઉપમા

592. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
સ્વામીજીએ <u>આવીને</u> અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું.

A)હેત્વર્થકૃદંત B)સંબંધક ભૂતકૃદંત
C)ભૂતકૃદંત D)ભવિષ્યકૃદંત

593. 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.

A)જિજ્ઞાસા B)પ્રાપ્તિ C)જાગૃતિ D)અણગમો

594. '<u>મહાબાહુ</u> અર્જુનને સામાન્ય લૂંટારુઓએ લૂંટ્યો'- લીટી કરેલ સમાસ ઓળખો.

A)તત્પુરુષ B)કર્મધારય
C)બહુવ્રીહિ D)એકપણ સાચુ નથી

570)C, 571)B, 572)B, 573)A, 574)C, 575)A, 576)C, 577)B, 578)B, 579)C, 580)B, 581)A, 582)C, 583)B, 584)A, 585)D, 586)A, 587)B, 588)B, 589)A, 590)D, 591)B, 592)B, 593)D, 594)C.

595. 'કરેલ ઉપકારને ભૂલી જનાર'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) કૃતઘ્ની B) કૃતાર્થ C) કૃતજ્ઞી D) કૃતનિશ્ચયી

મુખ્ય સેવિકા - 8/1/2017

596. સમાસ ઓળખાવો : ટપાલપેટી
A) મધ્યમપદલોપી સમાસ B) તત્પુરુષ
C) ઉપપદ D) બહુવ્રીહિ

597. આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી.
A) તેણે B) વાદળી C) ચડ્ડી D) હતી

598. સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા'
A) હુકમ B) પરવાનગી C) આજ્ઞા D) અવજ્ઞા

599. અલંકાર ઓળખાવો : નિસર્ગ મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો.
A) યમક B) અનન્વય C) ઉત્પ્રેક્ષા D) ઉપમા

600. સમાસ ઓળખાવો : મહાવીર
A) દ્વિગુ B) કર્મધારય C) દ્વન્દ્વ D) ઉપપદ

601. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી
A) વાંગળી B) વાંસોડ C) વાંસલો D) વાંસણી

602. સમાનાર્થ શબ્દ લખો : રિપુ
A) મિત્ર B) અરિ C) રાક્ષસ D) સીધું

603. છંદ ઓળખાવો : દેવી વૈજ્ઞાનિકોના વિરતિભિદન શો, સિદ્ધ શૈલેશ ઊભો !
A) શાર્દૂલવિક્રીડિત B) શિખરિણી
C) મંદાક્રાન્તા D) સ્રગ્ધરા

604. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્ર કયો છે ?
A) ચકલી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી B) ચક્ર, ચકલી, ચર્ચા, ચાવી, ચંદ્ર
C) ચર્ચા, ચક્ર, ચકલી, ચંદ્ર, ચાવી D) ચંદ્ર, ચક્ર, ચકલી, ચાવી, ચર્ચા

605. અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે.
A) ઉપમા B) રૂપક C) શ્લેષ D) વર્ણાનુપ્રાસ

606. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક
A) માસિક B) સાપ્તાહિક C) પાક્ષિક D) દૈનિક

607. છંદ ઓળખાવો : નેવાધારે નયને વરસી પત્રથી દીકરી તે.
A) અનુષ્ટુપ B) મંદાક્રાન્તા C) પૃથ્વી D) હરિગીત

608. 'વાડ થઈને ચીભડા ગળે'-કહેવતનો અર્થ આપો.
A) વાડને ટેટા તરબૂચ ભાવે. B) વાડ જ ચીભડાં ખાઈ જાય.
C) રક્ષક જ ભક્ષક બને. D) વાડ વગર વેલો ના ચડે.

609. સંધિ લખો : ઉચ્ચાલન
A) ઉચ્ચ + અલન B) ઉદ્ + ચલન
C) ઉદ્ + ચાલન D) ઉચ્ચ + અલન

610. એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?
A) વિરુદ્ધાર્થી B) પ્રશ્નવાચક C) પર્યાયવાચી D) આશ્રિત પદ

611. રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી લાવીને કાદવ કાઢવો
A) કોઠી સાફ કરવી B) કામમાં સફળતા મળવી
C) ચોટેલો કોદવ કાઢવો D) નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી

612. વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ
A) પરોક્ષ B) નિરપેક્ષ C) સાપેક્ષ D) અક્ષ

વિસ્તરણ અધિકારી - 7/1/2017

613. નીચેમાંથી સાચી જોડણી કઈ છે ?
A) મહત્ત્વાકાંક્ષી B) મહત્વકાંક્ષી
C) મહત્વાકાક્ષી D) મહત્ત્વાકાક્ષી

614. સમાસ ઓળખાવો : 'મહેશ્વર'
A) દ્વિગુ B) કર્મધારય C) બહુવ્રીહિ D) ઉપપદ

615. નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો :
કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો.
A) કરુણ B) ગીતો C) સાંભળી D) તે

616. 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી.'-આ કયા પ્રકારનું વાક્ય છે ?
A) કર્તરી B) કર્મણિ C) વિધ્યર્થ D) પ્રેરક

617. અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી'
A) ઉપમા B) યમક C) રૂપક D) અનન્વય

618. સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ'
A) ઉપપદ B) મધ્યમપદલોપી C) દ્વન્દ્વ D) દ્વિગુ

619. 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
A) બગીચો B) રાત્રિ C) ચંદ્ર D) જંગલ

620. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત'
A) પોળ B) ઓસરી C) બાલ્કની D) વંડી

621. નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :
વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો !
A) શિખરિણી B) મંદાક્રાન્તા C) હરિગીત D) પૃથ્વી

622. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
A) ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ
B) ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ
C) ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ
D) ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ

623. નીચેનામાંથી સાચી સંધિ શોધો : 'સાશ્ચર્ય'
A) સા + શ્ચર્ય B) સ + ઐશ્ચર્ય
C) સાસ્ + અશ્ચર્ય D) સ + આશ્ચર્ય

624. અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે !'
A) ઉપમા B) રૂપક C) શ્લેષ D) સરોવર

625. નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
A) પાણી B) ઘોડો C) પાક્ષિ D) સરોવર

595)A, 596)A, 597)B, 598)B, 599)C, 600)B, 601)D, 602)B, 603)D, 604)A, 605)D, 606)C, 607)B, 608)C, 609)C, 610)C, 611)D, 612)A, 613)A, 614)B, 615)A, 616)D, 617)D, 618)D, 619)D, 620)D, 621)A, 622)C, 623)D, 624)C, 625)B.

626. છંદ ઓળખાવો :
ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ.
A) મનહર B) અનુષ્ટુપ C) દોહરો D) ચોપાઈ

627. 'ખૂંદી તો <u>પ્રથમી</u> ખમે.....' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો.
A) પહેલું B) ખોળો C) પૃથ્વી D) જમીન

628. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.'
A) અનુસ્યૂત B) અદમ્ય C) અદ્ભુત D) અભિભૂત

629. 'પાણી બતાવવું'-રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?
A) તાકાતનો પરચો બતાવવો B) હાથ બતાવવો
C) પાણી કેવું છે તે બતાવવું D) પાણીમાંની ગંદકી બતાવવી

630. વિરોધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ'
A) સમષ્ટિ B) સમદષ્ટિ C) વૃષ્ટિ D) દષ્ટિ

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

631. 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
A) નુકશાન કરવું B) ઝઘડો શાંત કરવો
C) ઓટલો ભાંગી કાઢવો D) ઝઘડો કરવો

632. બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે?
A) નામયોગી B) નામ
C) અનુગ અને નામયોગી D) અનુગ

633. 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો.
A) સહાનુભુતી B) સહાનૂભૂતિ C) સહાનુભુતિ D) સહાનુભૂતિ

634. 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો.
A) વિશેષણ B) સંયોજક C) ક્રિયાવિશેષણ D) સંજ્ઞા

635. 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે?
A) અસત્ય B) અર્ધસત્ય C) કોઈ નહિ D) સત્ય

636. 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
A) જખ મારવી B) સગાઈ કરવી
C) અહીં દર્શાવેલ તમામ D) જૂઠ્ઠું બોલવું

637. 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે?
A) તત્પુરુષ B) કર્મધારય C) ઉપપદ D) મધ્યમપદલોપી

638. ગુજરાતી ભાષામાં નપુંસકલિંગ કોના માટે પ્રયોજાય છે?
A) સ્ત્રી
B) નાન્યતર જાતિ
C) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહી
D) પુરુષ

639. 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે?
A) વ્યતિરેક B) અનન્વય C) ઉપમા D) ઉત્પ્રેક્ષા

640. 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો.
A) શુભ કાર્યમાં વિઘ્ન નાખવું B) હવન કરવામાં હાડકા નાખવા
C) એક સાથે બે કામ કરવા D) શુભ કાર્ય કરવા

641. 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો.
A) મંદાક્રાંતા B) તોટક C) શિખરણી D) પૃથ્વી

642. 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે?
A) મંદાક્રાંતા B) શિખરણી C) સ્ત્રગ્ધરા D) અનુષ્ટુપ

643. 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો.
A) નિપાત B) કૃદંત C) અનુગ D) વિશેષણ

644. 'મારી આંખે કંકુના સૂરજ........' કાવ્ય કયા કવિનું છે?
A) સ્નેહરશ્મિ B) રાવજી પટેલ
C) રમેશ પારેખ D) ઉમાશંકર જોષી

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

645. 'માલસમાન જોઈને ખરીદો' -કૃદંત ઓળખાવો.
A) સંબંધક ભૂતકૃદંત B) ભૂતકૃદંત
C) સામાન્ય કૃદંત D) ભવિષ્યકૃદંત

646. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
માથે લેવું
A) ગુનો કબુલ કરવો B) માથા વજન ઉપાડવું
C) જવાબદારી સંભાળવી D) જવાબદારીમાંથી છૂટી જવું

647. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
A) અદીતીય B) અદ્વિતિય C) અદ્વિતીય D) અદવિતય

648. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
બધું જાણકાર
A) અંતર્યામી B) સંન્યાસી C) વિદ્વાન D) સર્વજ્ઞ

649. સમાસ ઓળખાવો : દરરોજ
A) કર્મધારય સમાસ B) અવ્યયીભાવ સમાસ
C) ઉપપદ તત્પુરુષ સમાસ D) મધ્યમપદલોપી સમાસ

650. 'નર્મદા' સમાસ લખો.
A) બહુવ્રીહી B) ઉપપદ
C) દ્વન્દ્વ D) મધ્યમપદલોપી સમાસ

651. 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
A) ડોક B) વિષ C) વાયુ D) વખાણ

652. 'સ્થૂળ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
A) કદાવર B) સંગમ C) સૂક્ષ્મ D) દુર્બળ

653. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.
લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા !
A) શંકા B) જરાય C) નોહતી D) તો

626)C, 627)C, 628)B, 629)A, 630)A, 631)D, 632)C, 633)D, 634)A, 635)D, 636)C, 637)D, 638)B, 639)B, 640)A, 641)D, 642)A, 643)A, 644)B, 645)A, 646)C, 647)C, 648)D, 649)B, 650)B, 651)B, 652)C, 653)D.

654. લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ?
A)ઉર્મિગીત B)ગરબી C)મુક્તક D)લોકગીત

655. "ઉત્તરોત્તર"શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ?
A)ઉત્તર + ઉત્તર B)ઉત્તરો + અત્તર
C)ઉત્તર + ઔત્તર D)ઉત્તરો + ત્ + તર

656. નીચે આપેલ શબ્દનાં વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.
શાશ્વત
A)ક્ષણિક B)કાયમી C)સ્થાવર D)હંમેશ માટે

657. નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે.
A)દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
B)ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો
C)ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
D)ઘોડો, ધીરજ, દિવસ ,દિવાળી,ભાગ

658. નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.
ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય.
A)દ્દષ્ટાંત B)ઉપમા C)શ્લેષ D)સજીવારોપણ

659. "યામિની" શબ્દ સમાનાર્થી શબ્દ :
A)યમની બહેન B)વીજળી C)સમીક્ષા D)રાત્રી

660. <u>અઢાર વરસ</u> જેને વહોરવાને આવે-રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
A)સંખ્યાવાચક B)રંગવાચક
C)પરિમાણવાચક D)ગુણવાચક

661. 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો.
A)વર્તમાનકૃદંત B)સામાન્ય કૃદંત
C)ભૂતકૃદંત D) ભવિષ્યકૃદંત

662. આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
એણે/ સિક્કોઓને / પેટીમાં / મૂકી દીધાં.
A) B) C) D)

663. "થાપોટ" તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો.
A)ટપલી B)નથણી C)થરથરાટ D)નઠારું

664. નીચાની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.
A)હિંસા - હિંસક B)તંત્ર - તાંત્રિક
C)પૈસા - પૈસાદાર D)લેખક - લેખિકા

665. 'શાર્દૂલ વિક્રીડિત' છંદના ગણનું સૂત્ર દર્શાવો.
A)ય મ ન સ ભ લ ગા B)મ ભ ન ત ત ગા ગા
C)મ સ જ સ ત ત ગા D)ભ ર ભ ન ય ય ય

666. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.
A)બીવું - બીક B)સડવું - સડો
C)શોભવું - શોભા D)વળગવુ - વાળગેલું

667. "કાશીમા કાબરી પાછળ દોડ્યા."આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.
A)કાશીમાથી કાબરી પાછળ દોડાયું
B)કાશીમા દોડયા અને કાબરી દોડી.
C)કાશીમાથી કાબરી પાછળ દોડાય છે.
D)એક પણ વિધાન સાચું નથી.

668. 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.'-કૃદંત ઓળખાવો.
A)સંબંધક ભૂતકૃદંત B)વર્તમાનકૃદંત
C)વિધ્યર્થકૃદંત D)ભૂતકૃદંત

669. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ
A)હેતુ + આભાસ B)હેતુ + આભાસ
C)હેત્વ + આભાસ D)હેત્વ + ભાસ

670. નીચે આપેલ વાકયમાંથી 'નિપાત' શોધી લખો.
ભૂલચૂક માફ કરશોજી
A)માફ B)કરશો C)ભૂલચૂક D)જી

671. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.
"ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -"
A)અભિમન્યુ B)ઘટોત્કચ C)યદુપતિ D)પરીક્ષિત

672. "કાન તળે કાઢી નાખવું"રૂઢિપ્રયોગનો અર્થ :
A)ઠપકો આપવો B)કાન વડે ધ્યાનથી સાંભળવું
C)કાન બહેરા થઈ જવા D)કોઈ વાત પર લક્ષ ન આપવું

673. તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ?
A)ગલઢેરા - ઝૂંપડાં B)હકડે ઠઠ - ભરચક
C)ફાંટ - પોટકું D)બકાલું - શાકભાજી

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

674. 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !'માં ક્યો અલંકાર છે?
A)રૂપક B)અંત્યાનુપ્રાસ C)વર્ણાનુપ્રાસ D)પ્રાસસાંકળી

675. નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.
A)મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન
B)પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
C)ધમાલ ન કરો, જરાય નહિ, નેન ભીના થજો
D)ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતના પૂર્વમાં

676. 'પરવારી જવું' રૂઢિપ્રયોગ ક્યો અર્થ સૂચવે છે ?
A)કામમાં છૂટકારો મેળવવો B)બધા કામ પૂરા કરવા
C)કામ પૂરું કરવા ઉતાવળ કરવી D)બધા જ કામ પુરા કરી નવરા થવું

677. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
પરગલ
A)પરગજુ B)ઉદાર C)હિંમતવાન D)ઘૃણાસ્પદ

654)D, 655)A, 656)A, 657)C, 658)D, 659)D, 660)A, 661)A, 662)B, 663)A, 664)D, 665)C, 666)D, 667)A, 668)C, 669)A, 670)D, 671)D, 672)D, 673)A, 674)C, 675)C, 676)D, 677)B.

678. <u>ગોળમટોળ</u> ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
A)આકારવાચક B)રંગવાચક
C)સ્વીકારવાચક D)પ્રમાણવાચક

679. નીચેનામાંથી વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
<u>શાકભાજી</u>નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.
A)સમુચ્ચય દ્વન્દ્વ B)વૈકલ્પિક દ્વન્દ્વ
C)ઈતરેતર દ્વન્દ્વ D)તત્પુરુષ સમાસ

680. 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.
A)હેત્વર્થ કૃદંત B)ભવિષ્ય કૃદંત
C)વર્તમાન કૃદંત D)સંબંધક કૃદંત

681. 'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
A)કનિષ્ઠ B)સમ્યક C)અગ્રજ D)કનિષ્ટ

682. 'મધુ હાલરડું ગાય છે'. વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.
A)મધુ હાલરડું ગવડાવે છે B)મધુ હાલરડું ગાતી હતી
C)મધુથી હાલરડું ગવાતું નથી D)મધુએ હાલરડું ગાયું

683. વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો.
A)એ, એ B)માં, એ C)થી, એ D)માં, થી

684. નીચે આપેલ કહેવતનો અર્થ શોધો.
ભેંસ ભાગોળે ને છાશ છાગોળે
A)ઘરમાં સવારે છાશ વલોવવી
B)ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી
C)કપોળ કલ્પનામાં રાચવું
D)ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી

685. 'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.
A)સચિન વિદાય લેશે B)સચિન વિદાય લે છે
C)સચિનથી વિદાય લેવાશે નહીં D)સચિનથી વિદાય લેવાઈ

686. ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?
A)બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ
B)પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ
C)મંદિરોમાં થતી પૂજા ભક્તિ
D)મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ

687. 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
A)નારી B)ચારુ C)તેજી D)નાજુક

PSI/ASI ગુજરાતી - 2/5/2015

688. એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે?
A)વિશેષણ B)સંજ્ઞા C)કૃદંત D)સર્વનામ

689. પેલાએ પુલીનને ધક્કો માર્યો. - વિશેષણ ઓળખાવો.
A)સાપેક્ષ વિશેષણ B)ગુણવાચક વિશેષણ
C)પ્રશ્નવાચક વિશેષણ D)દર્શક વિશેષણ

690. નીચેના પૈકી ક્યો શબ્દ પાણીનો પર્યાય નથી ?
A)સલિલ B)સરસી C)અંબુ D)ઉદક

691. સંધિ છોડો : અભ્યાસ
A)અભ્ય + અસ B)અભિ + યાસ
C)અભ્ય + આસ D)અભિ + આસ

692. સબરસનો સમાનાર્થી શબ્દ આપો.
A)મધુરસ B)સ્વાદિષ્ટ C)લવણ D)બધા રસ

693. ભમો ભરતખંડમાં સકળ ભોમ ખુંદી વળી- આ ક્યો છંદ છે ?
A)હરિગીત B)મંદાક્રાંતા C)પૃથ્વી D)શિખરિણી

694. ....પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો.
A)બાણાસૂર B)બાણશૂર C)બાણાસુર D)બાણાશૂર

695. નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો.
A)ચોપડી B)પાર્થિવ C)આરંભ D)નિત્ય

696. નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો.
A)મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
B)મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C)મહારાજે તરત ભાણુ તૈયાર કરવું
D)મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.

697. <u>કલ્પવૃક્ષ</u> જો કેરી ખાય. તેનો ચોર પેદા ન થાય. - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો.
A)ઉપપદ સમાસ B)મધ્યમપદલોપી સમાસ
C)બહુવ્રીહિ સમાસ D)તત્પુરુષ સમાસ

698. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી ક્યું વિરામચિહ્ન મૂકશો?
મારું ધ્યાન દોરવા તેણે <u>કહ્યું</u> : 'સાંભળો છો ?'
A)લઘુરેખા B)પૂર્ણવિરામ C)ગુરુવિરામ D)ગુરુ રેખા

699. અન્તઃપુર શબ્દનો સમાનાર્થી
A)રણવાસ B)દિલનગર
C)અંતરનો પ્રવાહ D)મનપુર

700. કહેવતનો અર્થ આપો - હૈવું તેવું હોઠે.
A)હૈયું ખાલી કરવું B)હૈયામાં ભરી રાખવું
C)હોઠ સાજા તો ઉત્તર જાજા D)વિચાર તેવી વાણી

701. શબ્દસમુહ માટે એક શબ્દ આપો. - કોઈની પણ મદદ ન લેનાર.
A)સ્વાવલંબી B)પરાવલંબી C)અવલંબી D)મદદગાર

702. નીચેનામાંથી કઈ કહેવત નથી ?
A)જીવ હેઠો બેઠો B)વાડ ચીભડા ગળે
C)અધુરો ઘડો છલકાય D)ઉતાવળે આંબા ન પાકે

703. પલાખું શબ્દનો ક્યો અર્થ છે ?
A)કૂટ પ્રશ્ન B)દાખલાનો પ્રશ્ન
C)આંકના પાડાનો પ્રશ્ન D)આલેખનો પ્રશ્ન

678)A, 679)A, 680)C, 681)A, 682)A, 683)D, 684)C, 685)D, 686)B, 687)A, 688)A, 689)D, 690)B, 691)D, 692)C, 693)C, 694)C, 695)B, 696)A, 697)B, 698)C, 699)A, 700)D, 701)A, 702)A, 703)C.

704. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ
A)વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
B)મામના ઘેર મોજ મસ્તી
C)આંખોની સામે હોવું D)ખૂબ જ નજીક હોવું
705. મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.
A)દ્રવ્ય વાચક B)ભાવવાચક
C)જાતિ વાચક D)વ્યક્તિ વાચક
706. મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરે- આ પંક્તિ છંદ જણાવો.
A)શિખરિણી B)પૃથ્વી C)મંદાક્રાંતા D)હરિગીત
707. નીચેનામાંથી ક્યું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ?
A)શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા
B)ગાંધીજી એટલે ગાંધીજી
C)તપેલી તપેલી છે
D)તે આવ્યો પણ બોલ્યો નહી
708. દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A)પુત્રપૌત્રી B)પ્રપૌત્રી C)દોહિત્રી D)સુતા
709. ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે ?
A)વલોપાત- કલ્પાંત B)દુર્ધર્ષતા - કોમળતા
C)અતીત-ભૂતકાળ D)સંગતિ-સહવાસ
710. ઇન્દિરા પાણી રેડે છે- કર્મણિ વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો.
A)ઈન્દિરાને પાણી રેડવું છે B)ઈન્દિરા પાણી રેડાવે છે
C)ઈન્દિરા પાણી રેડે D)ઈન્દિરાથી પાણી રેડાય છે
711. હુ <u>આંખોથી</u> સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વિભક્તિ દર્શાવે છે ?
A)કર્મ B)કર્તા C)કરણ D)અપાદાન
712. હુ છકડા પાસે ગયો- ભાવે વાક્ય બનાવો.
A)મારાથી છકડા પાસે જવાયું B)મારી પાસે છકડો ગયો
C)છકડા વહેલું પાસે ગયો D)છકડા પાસે હું આવ્યું
713. શહાણું માણસ લાભત નહીં - કહેવતનો અર્થ લખો.
A)ડાહ્યો માણસ લાંબુ જીવન જીવે નહી
B)જેવું જે કરે તેવું જ ભોગવે
C)જે જન્મે છેતે મૃત્યુ પામે છે
D)કરવાનું કાર્ય ન કરે.
714. મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો.
A)મે શિક્ષકને પાઠ વંચાવ્યો B)મારાથી પાઠ વંચાવ્યો
C)શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો D)મારા વડે પાઠ વંચાવ્યો
715. ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
A)ફુલના જાણે શોભે ગાલીચાB)છકડો એટલે છકડો
C)ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો
D)પથ્થર થરથર ધ્રુજે
716. મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો.
A)જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું
B)બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
C)છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી
D)એકલ પાંખ ઉડાયના એકલ નહીં હસાય
717. હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
A)સરસરાહટ B)કોલાહલ C)પર્ણમર્મર D)ઘોંઘાટ
718. વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યુ હતું આ વાક્યનો નિપાત દર્શાવો.
A)વસ્ત્ર B)સફેદ C)હતું D)પણ
719. ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
A)ભેખડ B)ગુફા C)કુહર D)બખોલ
720. <u>વિશ્વમાં</u> આ તો પહેલો બનાવ છે ? આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ ક્યો પ્રકાર દર્શાવે છે ?
A)કર્તા વિભક્તિ B)સંબોધન વિભક્તિ
C)કર્મ વિભક્તિ D)અધિકરણ વિભક્તિ
721. ખાડો ખોદે તે પડેની સમાનાર્થી કહેવત જણાવો.
A)હાથના કર્યા હૈયે વાગ્યા B)પાડાના વાંકે પખાલીને ડામ
C)કરે જગલોને ભોગવે ભગલો D)આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય
722. નીચેનામાંથી ક્યા વાક્યમાં નિપાત છે ?
A)વાંચ્યુ તેથી આવડ્યું B)વાંચશો તો પાસ થશો
C)કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે
D)વાંચ્યુ પણ આવડ્યું નહી
આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે.
723. આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ?
A)યમાતા રાજભાન સલગા B)ગાન જયરામા તાલભાસ
C)રામા ભાનતાલ સગજય D)ગાલ સનભાજરા તામાય
724. આવું ટી.વી. ફક્ત ગામમાં ફક્ત બે જણાને ત્યાં છે- નિપાત શોધો.
A)ફક્ત B)ત્યાં C)ગામમાં D)બે જણાને
725. નીચેનામાંથી ક્યું વાક્ય વાક્ય પ્રેરક વાક્ય છે ?
A)ધોની ક્રિકેટ રમાડે છે B)ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે
C)મહારાજ હસે છે D)એ રોજ ટોપરુ ખાય છે
726. માનસિક આવેગવાળુ- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A)સ્થિતપ્રજ્ઞ B)આવેગિક C)સંવેગિક D)સ્પૃશહણીય
727. મતિ મરી જવી- રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?
A)મડાગાંઠ પડવી B)બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
C)મન મરી જવું D)બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
728. ક્યો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો.
A)ખરાબ થવું B)બગડવું C)વણસવું D)વખોડવું
729. રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
A)વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે
B)હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ
C)ઊંઘતાને પાયે પગની જેલ
D)ફુલના જાણે શોભે ગાલિયા

704)A, 705)B, 706)A, 707)A, 708)B, 709)B, 710)D, 711)C, 712)A, 713)A, 714)C, 715)C, 716)C, 717)A, 718)D, 719)A, 720)D, 721)A, 722)C, 723)A, 724)A, 725)A, 726)C, 727)B, 728)D, 729)C.

730. મંદાક્રાન્તા છંદની પંક્તિ શોધીને લખો.
A)સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી
B) કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો
C)છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
D)કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય
731. કપાળે પરસેવો વળવો- રૂઢિપ્રયોગોનો અર્થ દર્શાવો.
A)મહેરબાની હોવી B) કસરત કરવી
C) હાથ મસ્તક પર હોવા D) ખૂબ મહેનત કરવી
732. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ?
A)સબંધ વિભક્તિ B) અપાદન
C)સંપ્રદાન D) અધિકરણ વિભક્તિ
733. આંખમાં આંખ પરોવવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
A)દયા અનુભવવી B) એક બીજા તરફ એકીટશે જોવું
C)આંખમાં કચરો પડવો D) આંખ આવવી
734. સુધાકર- સમાનાર્થી શબ્દ જણાવો.
A)તારા B)ચંદ્ર C) સૂર્ય D) વીજળી
735. <u>સૂર્યમુખી</u>ના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.
A)મધ્યમપદલોપી B) કર્મધારય C) ઉપપદ D) બહુવ્રીહિ
736. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ- શબ્દ માટે એક શબ્દ આપો.
A)બોધિવૃક્ષ B) કલ્પવૃક્ષ C) અશ્વત્થામા D) પરમવૃક્ષ
737. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
A)દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે B) હૈયુ જાણે હિમાલય
C)જીવનવાડી કરમાઈ ગઈ
D)તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી
738. કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે
A)ઈંડા સુંદર ચીતરેલા જ હોય
B)હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
C) મોર સુંદર હોય તેથી
D)મોરનું ઈંડુ ચીતરાઈ જ જાય
739. અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો.
A)નિર્ભય B)ડરપોક C) ભયભીત D) કાયર
740. કરેલા ઉપકારને ભુલી જનાર.. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો.
A)કૃતઘ્ની B) કૃતજ્ઞી C) કૃતનિશ્ચયી D) કૃતાર્થી
741. પર્યાયવાચી શબ્દોની જોડ.. એમાં શામા મોટી ખોટ ?
A)હરણ-મૃગ, સારંગ B) તોખાર- ગજ, હાથી
C) ગરલ- વિષ, ઝેર D) તાસીર- પ્રકૃતિ, સ્વભાવ
742. 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં.
A)આંખો ઠરવી B) ગૂડા ભાંગી નાખવા
C) કંઠે ભુજાઓ રોપવી D) તલવાર તાણવી
743. 26 જાન્યુ,2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષ શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ?
A)અનન્વય B)વ્યતિરેક C) ઉપમા D)ઉત્પ્રેક્ષા
744. પંદર દિવસમાં એકવાર પ્રગટ થનારું
A)સાપ્તાહિક B)પાક્ષિક C) માસિક D) પૌત્રિક
745. આમા કોણ બંધબેસતુ નથી ?
A)કંચન B)સોનુ C)સુવર્ણ D)કથિર
746. શિવ આ નામે ઓળખાતા નથી ?
A)ધુર્જટિ B)શંકર C) મહાદેવ D) નારાયણ
747. આપેલ વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો.
A)શશી B)યામિની C)સૂર્ય D)આકાશ
748. આપેલ શબ્દોમાંથી 'સાર્થ' શબ્દનો વિરોધી શોધો.
A)દુર્લભ B)વ્યર્થ C) જુદા D) વિયોગ
749. 'જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ' શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
A)ગંગાસ્વરૂપ B)બીજવર C) વિધવા D) વિધુર
750. આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
A)મિજબાની B)મીજબાની C) મીજબાનિ D) મિજબાનિ
751. આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ?
A)પર્વત B)હવા C) ઊંચા D) ઉપર
752. આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો.
A)તમે B) મૃદુતાથી C) સોનું D) કજિયાખોર
753. પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર.
A)રવિ-સૂર્ય B) જવાર-ભાટા
C)પિયક્કડ-શરાબી D) ઈબાદત-પૂજા
754. નીચે અપાયેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો.
A)દૂધ B)રસિક C) વૈધવ્ય D) નિયમિત
755. આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A)ખુબસુરત B) ખૂબસૂરત C) ખૂબસુરત D) ખુબસૂરત
756. આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો "વિશેષણ" શબ્દ શોધો.
A)ચમકદાર B) ઘોડા C) દરબાર D) કાળા
757. નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો
A)રૂપક B)અનન્વય C) સજીવારોપણ D) વ્યાજ સ્તુતિ
758. 'પગરખું' શબ્દનો સમાસ ઓળખાવો '
A)દ્વન્દ્વ B)તત્પુરૂષ C) ઉપપદ D) કર્મધારય
759. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલ નો વિરુધ્ધાર્થી છે?
A)નબળુ B)મરેલ C) મુરદાલ D) કાચુ
760. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે?
A)દાતા B)શેઠ C) દેનાર D) શ્રીમંત
761. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ"નો વિરુદ્ધાર્થી છે?
A)મોટુ B)સ્થૂલ C) જાડુ D) સંપુર્ણ

730)C, 731)D, 732)C, 733)B, 734)B, 735)A, 736)B, 737)B, 738)B, 739)A, 740)A, 741)B, 742)C, 743)D, 744)B, 745)D, 746)D, 747)A, 748)B, 749)D, 750)A, 751)A, 752)A, 753)B, 754)C, 755)B, 756)D, 757)B, 758)C, 759)C, 760)A, 761)B.

762. નીચેના પૈકી કયો શબ્દ "કાળોત્રી" નો વિરૂદ્ધાર્થી છે?
A)પત્રીકા B)પાનોત્રી C)જન્મોત્રી D)કંકોત્રી

763. "તલવાર તાણવી" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
A)બોલતી બંધ કરવી B)તલવારને ચમકાવવી
C)સખત માર મારવો D)સંઘર્ષમાં ઉતરવું

764. "ગણી શકાય નહી તેટલુ" શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
A)અગણિત B)વિગણિત C)નગણિત D)નવગણિત

765. "મૂછનો દોરો ફૂટવો" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
A)મોટા માથે મગજમારી B)સાહસના કામ કરવા
C)મુછમાં દોરો લગાવવો D)જુવાની આવવી

766. "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો.
A)દાડમ જેવી B)ચાંદી જેવી C)કંચન જેવી D)દૂધ જેવી

767. ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય.......હતો
A)અસંતોષજનક B)અસામઈક
C)અણધાર્યા D)અવાચક

768. "દયા-પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો.
A)બહુવ્રીહિ B)કર્મધારય C)તત્પુરુષ D)દ્વન્દ્વ

769. "પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો.
A)પ્ર + ઈક્ષક B)પ્રક + શક C)પ્રક્ + શક D)પ્ર + અક્ષક

770. નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી"
A)વર્ણાનુપ્રાસ B)અનન્વય C)રૂપક D)ઉપમા

771. "આભ તૂટી પડવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
A)મુશ્કેલીનો સામનો કરવો B)વિજળીનો ગડગડાટ થવો
C)ધોધમાર વરસાદ આવ્યો D)ઓચિંતી મુશ્કેલી ઊભી થવી

772. "લોહી ઉકળવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
A)શરમ ના આવવી B)ઝઘડો કરવો
C)માર મારવો D)ગુસ્સે થવું

773. "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો.
A)પોલીસ ચોરનો સાથ આપે
B)રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ
C)વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય
D)રક્ષક જ ભક્ષક બને

774. નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાંહળાંથતી નદીને જોતો"
A)ઉપમા B)અનન્વય C)સજીવારોપણ D) રૂપક

775. "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો.
A)દ્વન્દ્વ B)તત્પુરુષ C)કર્મધારય D)બહુવ્રીહિ

776. "એક જ સમયમાં થઈ ગયેલુ" શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
A)સમકાલીન B)સમયકાલીન C)અનુકાલીન D)પૂર્ણકાલીન

777. ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ...માફક આવી નહી.
A)પ્રદુષણ B)વાતારણ C)આબોહવા D)ગીચતા

778. "બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
A)સામુદ્રધુની B)અખાત C)ભૂશિર D)સમુદ્રકલ્પ

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017

779. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A)પરિક્ષીત B)પરીક્ષીત C)પરીક્ષિત D)પરિક્ષિત

780. 'ચક્ષુઃ શ્રવા' કોને કહેવાય ?
A)કાનથી સાંભળનાર B)કાન અને આંખોથી પારખનાર
C)આંખોથી સાંભળનાર D)કાનથી બહેરો આંખોથી અંધ

781. બહુવ્રીહિ સમાસનું ક્યું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
A)મયૂરવાહિની B)નમાયાં
C)દીર્ઘદૃષ્ટિ D)ક્ષુધાતુર

782. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
તું ખાવાનું <u>મોકલનાર</u> કોણ ?
A)ભૂતકૃદંત B)આજ્ઞાર્થ કૃદંત
C)ભવિષ્યકૃદંત D)વિધ્યર્થ કૃદંત

783. 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો.
A)અનન્વય B)વર્ણાનુપ્રાસ C)શબ્દાનુપ્રાસ D)રૂપક

784. દુહાના મુખ્ય લક્ષણો જણાવો.
A)ગેયતા, લંબાણ B)ચોટ, લાઘવ
C)આરોહ, અવરોહ D)લય, ગતિ

785. છંદ શાસ્ત્રમાં કુલ ....ગણની રચના કરી છે.
A)ચાર B)છ C)આઠ D)દસ

786. 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો.
A)ય B)નેય C)ને D)યો

787. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
કાનન
A)વન B)કૂમળું C)કાજળ D)કર્મ

788. લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ ક્યાં કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે ?
A)પદ B)ભજન C)આખ્યાનખંડ D)લોકગીત

789. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.
A)ગર્વ X અભિમાન B)ઠાઠ X વૈભવ
C)ઉપકાર X અપકાર D)નેહ X સ્નેહ

790. મીંડા આગળ એકડો માંડવો- રૂઢિપ્રયોગનો અર્થ લખો.
A)ગણિતના દાખલા કરવા B)શૂન્યમાંથી સર્જન કરવું
C)હિસાબ કરવો D)સરવાળો કરવો

791. શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની-બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ?
A)અર્થછાયા B)ભાવપલટો C)ચમત્કૃતિ D)લાઘવ

762)D, 763)D, 764)A, 765)D, 766)C, 767)A, 768)C, 769)A, 770)A, 771)D, 772)D, 773)D, 774)A, 775)B, 776)A, 777)C, 778)A, 779)C, 780)C, 781)D, 782)C, 783)C, 784)B, 785)C, 786)A, 787)A, 788)D, 789)C, 790)B, 791)D.

792. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

A)પ્રતિનિધિ B)પ્રતિનીધી C)પ્રતિનિધી D)પ્રતિનીધિ

793. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
- તટ

A)તુટ B)કાંઠો C)ટાણું D)ઝટ

794. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.

A)ગજ x દ્વિપ B)સૂર્ય x રવિ
C)ચારુ x કાન્ત D) છાનીમાની x જાહેર

795. 'શાલભંજિકા'નો વિસ્તૃત અર્થ શો થાય છે ?

A)લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી
B)લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી
C)લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી
D)લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી

796. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો :
ખેલ માંડવો

A)રમત રમવી B) ખેલની શરૂઆત
C)ખેલ કરવો D) નાટકની શરૂઆત કરવી

797. 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

A)સ્મરણીય B) અવિસ્મરણીય
C)રમણીય D)સ્પૃહણીય

798. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
મુક્તા -

A)માછલી B)માયાળુ C) મોતી D)મીઝા

799. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

A)વીર x કાયર B) બહાદુર x સરદ
C)માતેલું x મદમસ્ત D)ઉદ્યમ x શ્રમ

800. 'યુદ્ધસ્થ વિગતજ્વર' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ?

A)યુદ્ધ કર, ડર બન B) યુદ્ધો કરવાના છોડી દો
C)જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ D) જડતા છોડીને યુદ્ધ કર

801, નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
પગ ટકવો -

A)અવર જવર બંધ કરવી B) સ્થિર થવું
C)જતા રહેવું D) પગ ઉપર ઊભા રહેવું

802. નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી

A)બોલી B)ભાષા C) વૈખરી D)શબ્દો

803. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

A)મ્યુનીસિપાલિટી B) મ્યુનિસીપાલીટિ
C)મ્યુનિસિપાલિટી D) મ્યુનિસિપાલીટી

804. મુક્તકનો વિશેષ ગુણ કયો છે ?

A)છંદ B)ચમત્કૃતિ C) પારદર્શિતા D)સચોટતા

805. 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો.

A)કર્મધારય B)બહુવ્રીહિ C)ઉપપદ D)મધ્યમપદલોપી

806. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
હું પણ ત્યાં <u>જઈને</u> બેસતો.

A)વર્તમાન કૃદંત B) સંબંધક ભૂતકૃદંત
C)આજ્ઞાર્થ કૃદંત D)વિધ્યર્થ કૃદંત

807. 'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ'- અલંકાર ઓળખાવો.

A)ઉપમા B)ઉત્પ્રેક્ષા C)રૂપક D)વ્યતિરેક

808. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરિયે કામ-પંક્તિમાં કયો છંદ છે તે લખો.

A)દોહરો B)અનુષ્ટુપ C)ચોપાઈ D)સવૈયા

809. 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' વાક્યોમાં નિપાત જણાવો.

A)દસ B)આવી C)ફક્ત D)જાઓ

810. 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો.

A)કર્મધારય B)તત્પુરુષ C)બહુવ્રીહિ D)ઉપપદ

811. પ્રોષિતભર્તૃકા શાનુ આલંબન છે ?

A)કરુણતાનું B)વિયોગ શૃંગારનું
C) વાત્સલ્યનું D)સૌભાગ્યનું

812. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
<u>લખવું વાંચવું</u> એ કંઈ કેળવણી નથી.

A)વિધ્યર્થ કૃદંત B)સંબંધ કૃદંત
C)ભવિષ્ય કૃદંત D)વર્તમાન કૃદંત

813. નીચેનામાંથી ક્યું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?

A)કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે.
B)ધીમે-ધીમે તે ડગ ધરતો- કોઈ મત્ત ગજેન્દ્રની માફક
C)વદન સુધાકરને રહુ નિહાળી
D)ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો

814. મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.

A)મંદાક્રાંતા B)પૃથ્વી C)શિખરિણી D)હરિગીત

815. 'કળ વળવી'- રૂઢિપ્રયોગનો અર્થ આપો.

A)ભૂખ લાગવી B)ડર લાગવો
C)ચિંતા થવી D)નિરાંત થવી

816. 'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.

A)થઈ B)ગયા C)તો D)ખુશ ખુશ

792)A, 793)B, 794)D, 795)B, 796)A, 797)D, 798)C, 799)A, 800)D, 801)B, 802)C, 803)C, 804)B, 805)A, 806)B, 807)B, 808)C, 809)C, 810)C, 811)B, 812)A, 813)C, 814)A, 815)D, 816)C.

અન્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

817. 'દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય'- કયો અલંકાર છે ? - **ઉત્પ્રેક્ષા**

818. આપેલ શબ્દની સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો (ધ્વનિશ્રેણી) શોધો. ત્રિશુળ - **ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ**

819. ધોબીના ઘરમાં ખાતર પડે તે ઘરાકનું જાય.- કહેવતનો સાચો અર્થ જણાવો. - **સારું કામ કરવા જતા આપત્તિ આપવી**

820. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - આદુના રસવાળુ પીણું - **જિંજર**

821. 'રામસીતા' શબ્દનો સમાસ જણાવો. - **દ્વન્દ્વ**

822. આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. શારદાકાકી દુ:ખી થયા - **શારદાકાકીથી દુ:ખી થવાયું**

823. સંધિ જોડો : મનસ્ + ચક્ષુ - **મનશ્ચક્ષુ**

824. 'ચારે હાથ ભોંયે પડવા' રૂઢિપ્રયોગનો અર્થ આપો. - **બધી રીતે નિ:સહાય થવું**

825. 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - **ક્ષિતિજ**

826. આપેલ વાક્યનો કર્મણિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો : પહાડ ઉપર પરમાનંદ ચડે છે - **પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે**

827. સંધિ છોડો : ઐતિહાસિક - **ઈતિહાસ + ઈક**

828. 'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય'- પંક્તિ કયા છંદમાં છે ? - **<u>ચોપાઈ</u>**

829. આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો : અર્ણીદાર - **બૂઠું**

830. આપેલા વાક્યમાંથી સાચો પ્રત્યય શોધો : નાનપણનું રેલગાડીએ બેસીને બાપા સાથે અમદાવાદ જતો.- **માં**

831. આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો : હડફ - **જલદી**

832. આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : <u>પહેલા</u> નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયુ - **સંખ્યાવાચક**

833. આપેલ શબ્દનો અર્થ (શબ્દસમજૂતિ) દર્શાવો. : ગાભરી - **ભયભીત**

834. છંદનો પ્રકાર જણાવો : દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય - **અનુષ્ટુપ**

835. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : નદીની કાંકરાવાળી જાડી રેતી - **વેકુર**

836. અલંકારનો પ્રકાર જણાવો : ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? - **અનન્વય**

837. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો : કાળુ એ ન <u>બોલવાના</u> સોગન ખાધા હતા. - **સામાન્ય કૃદંત**

838. રૂઢિપ્રયોગનો અર્થ આપો : ઘરભંગ થવો. - **પત્નીનું મૃત્યુ થયું**

839. આપેલ વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી સાચા પ્રત્યય જણાવો : અલી પોતાનું જગ્યામાં ખસ્યો નહીં. - **ની તથા થી**

840. સંધિ જોડો : પુનર્ + ઉક્તિ - **પુનરુક્તિ**

841. આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. : બાળકો મેદાનમાં રમે છે. - **બાળકોને મેદાનમાં રમાડે છે.**

842. આપેલ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. : પ્રધાન. - **ગૌણ**

843. વાક્યનો ભાવેપ્રયોગ જણાવો : હર્લિન કૂદાકૂદ કરે. - **હર્લિનથી કૂદાકૂદ કરાય**

844. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો : દઠબું - **ઠેકું**

845. 28 માત્રા કયા છંદમાં હોય છે ? - **હરિગીત**

846. 'અનિરુદ્ધ' શબ્દનો અર્થ જણાવો. - **રોકેલું**

847. કર્મણિ પ્રયોગનો સાચો અર્થ શોધો. મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. - **મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો.**

848. રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો : એ આજે <u>સંતરામપુર</u> ગયો. - **સ્થળવાચક**

849. 'વડવાનલ' શબ્દની સમજૂતી દર્શાવો. - **સમુદ્રમાં લાગતો અગ્નિ**

850. વાક્યને પ્રેરક વાક્ય બનાવો : મનસુખ ખેતરનો પાક કાપે છે. - **માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે.**

851. સંધિ છોડો : આવિર્ભાવ. - **આવિ: + ભાવ**

852. 'આંબુ' શબ્દનો અર્થ જણાવો.- **પહોંચવું**

853. છંદનો પ્રકાર જણાવો : એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ. - **દોહરો**

854. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : હોલા જેવું કાળજું હોવું. - **અત્યંત નાહિંમત હોવું**

855. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : મોર્ય. - **અગાઉ**

856. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ગાયનના તાલના કાની સાથે જ તાળી પડવી તે. - **સમપાણિ**

857. 'નહોરા' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. - **આજીજી**

858. કર્મણિપ્રયોગ જણાવો : વિનુ ઓફિસેથી આવ્યો હતો. - **વિનુથી ઓફિસેથી અવાયું હતું.**

859. 'દૂઝે' શબ્દનો અર્થ-સમજૂતી આપો. - **ટપકે**

860. ભાવેપ્રયોગ જણાવો : મણિબહેન બોલતા હતા. - **મણિબહેનથી બોલાતું હતું.**

861. કહેવાતનો સાચો અર્થ જણાવો : બાવો નાચ્યો એટલે બાવી નાચી. - **શક્તિ વગરનું આંધળું અનુકરણ કરવું**

862. ખોટા પદપ્રત્યય શોધો : એની પહેલાથી સાલનું છત્રી લાવેલો. - **ની તથા એ**

863. 'સુષુપ્ત' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.- **જાગ્રત**

864. 'ધડકલી' શબ્દનું શિષ્ટરૂપ આપો. - **ગોદડી**

865. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - **શેઢો**

866. ભાવેપ્રયોગ જણાવો : તું શું કરી શકે ?. - **તારાથી શું કરી શકાય?**

867. કહેવતનો અર્થ આપો : નાતરે જવું તે દહાડા ભાગવા - **મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે**

868. સંધિ જોડો : ઉદ્ + ચાલન. - **ઉચ્ચાલન**

869. 'ઉલાળ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો. - **ધરાળ**

870. ખોટા પદપ્રત્યયની જગ્યાએ સાચા પ્રત્યય લખો : ગામડાંઓને મોસમના મોસમથી ચીજો-વેચતા.....- **મા, એ તથા ની**

871. પ્રેરક વાક્ય બનાવો : કર્ણ સૂરજની સ્તુતિ કરે છે. - **કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે.**

872. સંધિ છોડો : પદ્ધતિ. - **પદ્ + હતિ**

873. આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો. : મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. લીલી ક્રોને ઉગાડવી છે. - **ત્યાં**

874. કર્તરિ પ્રયોગ જણાવો.: ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. - **ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે.**

875. 31/32 માત્રા ક્યા છંદમાં હોય છે ? - **સવૈયા**

876. 'ડાંફ' શબ્દનો અર્થ-સમજૂતી આપો. - **મોટું પગલું**

877. વાક્યનો કર્તરિ પ્રયોગ જણાવો :લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું. - **લક્ષ્મી તિરસ્કારભર્યું હસતી હતી.**

878. સંધિ છોડો : યશોજ્જવલા. - **યશ + ઉદ્ + જવલ**

879. રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો : કુસ્તી <u>મેદાનમાં</u> લડાય. - **સ્થળવાચક**

880. વાક્યનો કર્મણિપ્રયોગ જણાવો : પુસ્તક વિના હું ભણું કેમ ? - **પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?**

881. તળપદા શબ્દનું શિષ્ટરૂપ જણાવો : ઢીઢોર. - **ઢોરમાટીનું**

882. 'કોરવું' શબ્દનો અર્થ સમજાવો.- **તોડવું**

883. આપેલ વાક્યનો પ્રેરક વાક્ય જણાવો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. - **અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું.**

884. આપેલ વાક્યનો ભાવેપ્રયોગ જણાવો. : ગામલોકો આવી ગયા. - **ગામલોકોથી આવી જવાયું.**

885. કહેવતનો અર્થ જણાવો : બ્રહેડાં ખાવાંને જાયફળની કેફ રાખો. - **ગરીબ હોવાં છતાં વૈભવના સ્વપ્ન જોવાં**

886. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. : જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું. - **અનિર્વાચ્ય**

887. સંધિ જોડો. સુ + અલ્પ - **સ્વલ્પ**

888. 'વિધિ'નો વિરોધી શબ્દ જણાવો. - **નિષેધ**

889. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હુજ્જત. - **હઠ**

890. વાક્યનો કર્મણિપ્રયોગ જણાવો : અમરો ટંડેલ બની જશે. - **અમરાથી ટંડેલ બની જવાશે**

891. 'તાસીર ફેરવવી'- રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? - **પરિસ્થિતિ બદલવી**

892. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સત્યને ટકાવી રાખનાર દેવી. - **ઋતુંભરા**

893. ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા. પંક્તિ ક્યા છંદ અનુસાર છે ? - **હરિણી**

894. 'સવારે ફરવું આવશ્યક છે'- કૃદંત ઓળખાવો. - **વિધ્યર્થ કૃદંત**

895. 'દિગ્મુઢ' શબ્દની સમજૂતી/અર્થ જણાવો. - **આશ્ચર્યચકિત**

896. શિખરિણી છંદનું બંધારણ જણાવો. - **યમનસભલગા**

897. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કોડિયા જેવું કપાળ હોવું - **કમનસીબ હોવું**

898. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હરફ - **શબ્દ**

899. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રસન્ન કરવું તે - **સમારાધન**

900. વાક્યનો યોગ્ય કર્તરિ પ્રયોગ જણાવો : ફળિયામાં મારાથી વૃક્ષો રોપાયા. - **ફળિયામાં મેં વૃક્ષો રોપ્યાં.**

901. 'બંધકી' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. - **વૈશ્યા**

902. શબ્દનો અર્થ સમજાવો. આપદભાર - **દુઃખનો ભાર**

903. વાક્યનો પ્રેરક જણાવો : હું કવિતા લખું છું. - **મારી પાસે કવિતા લખાવે છે.**

904. સંધિ છોડો : છિન્ન. - **છિદ્ + ન**

905. સંધિ છોડો. પ્રતિષ્ઠિત. - **પ્રતિ + સ્થિત**

906. 'સચિંતમેર' શબ્દનો અર્થ-સમજૂતી જણાવો. - **ચિંતાતુર**

907. શાર્દૂલવિક્રીડિતનું બંધારણ જણાવો. - **મસજસતતગા**

908. આપેલ વાક્યનું પ્રેરક વાક્ય જણાવો. માળીએ ઝાડ કાપ્યું. - **માળી પાસે ઝાડ કપાવ્યું.**

909. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ. - **આસક્તિ**

910. રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. <u>થોડી વાર</u>, ઈશ્વર જોઈ રહ્યો. - **સમયવાચક**

911. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. પતિયાર. - **વિશ્વાસ**

912. શબ્દનો અર્થ જણાવો. જાચજયના. - **યાચકવૃત્તિ**

913. વાક્યનો કર્તરિપ્રયોગ જણાવો. અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. - **અમરાવતીના પ્રવાસે અમે ગયા**

914. સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકો જણાવો. વચ્ચે બોલીશ. મૂરખો બનાવીશ. - **તો**

915. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. <u>પાંચ</u> માણસો ભેગા કામ કરતા હોય છે. - **સંખ્યાવાચક**

916. શબ્દની સમજૂતી આપો. શોણિત - **લોહી**

917. છંદનો પ્રકાર જણાવો: નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલા. - **પૃથ્વી**

918. યોગ્ય સ્વર વ્યંજનો જણાવો. બુલંદ. - **બ્ + ઉ + લ્ + અં + દ્ + અ**

919. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. હર્ષિનને <u>બોલવું</u> ગમતું નથી. - **સામાન્ય કૃદંત**

920. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓરિયો વીતવો. - **સારો પ્રસંગ સફળ રીતે પૂરો થવો**

921. અલંકારનો પ્રકાર જણાવો. કિરીટભાઈ નામના આચાર્ય છે. - **શ્લેષ**

922. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંકેત મુજબ પ્રેમીને મળવા જતી નાયિકા. - **અભિસારિકા**

923. 'તેણે ચા અને પાણી પીધાં'- અધોરેખિત પદોથી ક્યા સમાસની શક્યતા ઊભી થાય છે ? - **દ્વંદ્વ**

924. 'અલી, બોલ તો ખરી !'- ક્યું વાક્ય છે ? - **ઉદ્ગાર વાક્ય**

925. 'તું મોં સંભાળીને બોલેજે'- વાક્ય ક્યા કાળને વ્યક્ત કરે છે ? - **વર્તમાનકાળ**

926. 'કાબુ', 'કૂંચી', 'તોપ', 'જાજમ'- ગુજરાતીમાં ઉપયોગમાં આવતા આ શબ્દો મૂળ કઈ ભાષાના છે ? - **તુર્કી**

927. 'નીલમ ધીરુ બોલે છે'- વાક્યમાં 'ધીરુ' એ શું છે ? - **ક્રિયાવિશેષણ**

928. અરજીલેખનમા 'પ્રેષક'નું નામ કઈ જગ્યાએ આવે ? - **આરંભમાં જમણી બાજુએ**

929. રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. - **ઉપપદ સમાસ**

930. સંધિ છોડો. નિશ્ચિંત. - **નિસ્ + ચિંત**

931. 'સમજણ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો. - **ગેરસમજણ**

932. 'ખોભણ' શબ્દનો સમાનાર્થી જણાવો. - **ગુફા**

933. વાક્યનો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. - **ચોપાઈ**

934. રૂઢિપ્રયોગનો અર્થ આપો. જાદુઈ લાકડી ફરવી. - **મંત્રતંત્ર કે જાદુટોણા કરવા**

935. અલંકાર જણાવો. જમીન પર પૃથિવીવલ્લભનું શબ ઘુંદાઈને રોટલો બની પડ્યું હતું. - **રૂપક**

936. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા. - **ક્ષિતિજ**

937. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. વરિયો. - **ફળદ્રુપ**

938. રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? - **સમયવાચક**

939. 'દ્રવ્ય' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. - **વસુ**

940. છંદનો પ્રકાર જણાવો. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. - **અનુષ્ટુપ**

941. સમાસ ઓળખાવો. યશાંકી. - **બહુવ્રીહિ**

942. કૃદંતનો પ્રકાર જણાવો. તે કેડ બાંધીને રમે છે. - **સંબંધક ભૂતકૃદંત**

943. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. છાતી પર લાળા. - **અત્યંત દુઃખદ સ્થિતિ**

944. અલંકારનો પ્રકાર જણાવો. રખે છૈયો થાકી જાય. - **ઉત્પ્રેક્ષા**

945. 'વ્યક્તિ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો. - **સમષ્ટિ**

946. સંધિ જોડો. ફળ + આગમ. - **ફલાગમ**

947. સંધિ છોડો. અભિષિક્ત. - **અભિ + સિક્ત**

948. સંધિ છોડો. સંચય. - **સમ્ + ચય**

949. સંધિ જોડો. સરસ્ + જ. - **સરોજ**

950. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગળે ટાંટિયા ભરાવવા. - **મુશ્કેલ સ્થિતિમાં મૂકવું**

951. સમાસ ઓળખાવો. દરરોજ. - **અવ્યયીભાવ**

952. સ્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.- **મરભનયયય**

953. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અન્ન જળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે. - **પ્રાયોપવેશન**

954. 'અનંગ' શબ્દનો સમાનાર્થી શું થાય ? - **મન્મથ**

955. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. : દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. - **ભૂતકૃદંત**

956. અલંકારનો પ્રકાર જણાવો : સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ? - **વ્યતિરેક**

957. આપેલ વાક્યનો પ્રેરક વાક્ય જણાવો. દયાશંકરે વાર્તા કહી.- **દયાશંકર પાસે વાર્તા કહેવડાવી.**

958. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે - **કર્તૃવાચક**

959. આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ભાસંગ. - **મહાજરો**

960. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. જળકમળવત હોવું. - **સંસારની માયાથી મુક્ત હોવું**

961. સંધિ છોડો. પ્રાણ. - **પ્ર + અન**

962. સંધિ જોડો. નિગમ + આગમ. - **નિગમાગમ**

963. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ખભે ભરાવવાની ઝોળી. - **ખડિયો**

964. ટીપણું શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. - **પંચાંગ**

965. કહેવતનો અર્થ જણાવો. અન્ન આહારે ને ઘી વ્યવહારે. - **જ્યા જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ.**

966. અલંકારનો પ્રકાર શોધો. ખારવા મોગરાના ફૂલ. - **રૂપક**

967. 'દુકાળ' શબ્દનો સમાસ ઓળખાવો. - **કર્મધારય**

968. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરહરિ. - **મધ્યમપદલોપી**

969. વાક્યનો ભાવેપ્રયોગ જણાવો. યશાંકી પગે પડી. - **યશાંકીથી પગે પડાયું**

970. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. - **જડસું**

971. સાચા સ્વર વ્યંજનો જણાવો. સાક્ષાત્કાર. - **સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ**

972. રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. કંચને ટાઈમટેબલ બનાવેલું હતું. - **ભૂતકૃદંત**

973. શબ્દનો અર્થ જણાવો. 'નિમિષ' - **આંખનો પલકારો**

974. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. દાણો ચાંપી જોવો. - **પ્રયત્ન કરી જોવો.**

975. અલંકારનો પ્રકાર જણાવો. એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે ક્યા અલંકાર તરીકે ઓળખાય છે ? - **શ્લેષ**

976. છંદનો પ્રકાર જણાવો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ. - **શિખરિણી**

977. કહેવતનો અર્થ જણાવો. ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? - **મીઠા બોલથી કામ થતું હોય તો કડવા વેણની શી જરૂર ?**

978. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અને ગુઢ્ઢ અવાજે અણધાર્યો સવાલ કર્યો. - **ગુણવાચક**

979. અલંકારનો પ્રકાર શોધો. વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો. - **આંતરપ્રાસ**

980. ગીર્વાણ- શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. - **સુર**

981. વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? - **આગમન-નિગમન પદ્ધતિ**

982. રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. ધજા બાંધવી. - **કીર્તિ ફેલાવવી**

983. સંધિ છોડો. એકૈક. - **એક + એક**

984. સંધિ જોડો. તદ્ + રૂપ. - **તદ્રુપ**

985. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચંદ્ર પાસેનું તારાઓનું ઝુમખું. - **ગચુમલી**

986. આપેલ વાક્યનો ભાવેપ્રયોગ જણાવો. એટલામાં શીલા આવી ગઈ. - **એટલામાં શીલાથી આવી જવાયું.**

987. વાક્યનો નિપાત જણાવો. ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફૂર્યો. - **પણ, જ**

988. વાક્યનો પ્રેરક જણાવો. બાળકોએ ચિત્ર દોર્યા. - **બાળકોથી ચિત્ર દોરાશે**

989. નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવાને ? - નિપાતનો પ્રકાર જણાવો. - **ખાતરીવાચક**

990. 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. - **ચેનચાળા**

991. ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે ક્યો અલંકાર બને છે ? - **રૂપક**

992. રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. - **સંબંધક ભૂતકૃદંત**

993. 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. - **અણગમો**

994. મહાબાહુ અર્જુનને સામાન્ય લુટારુઓએ લૂંટ્યો. લીટી કરેલ સમાસ ઓળખો. - **કર્મધારય**

995. 'કરેલા ઉપકારને ભૂલી જનાર'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - **કૃતઘ્ની**

996. સંધિ છોડો. હવન. - **હો + અન**

997. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. ધૂપસળી. - **મધ્યમપદલોપી**

998. રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખ મળી જવી. - **ઊંઘ આવી જવી.**

999. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. મારે ખેતુકળિયા જવાનું છે. - **હેત્વર્થ કૃદંત**

1000. અલંકારનો પ્રકાર જણાવો. કૈં કેટલાયે રંગ હું તો ધોળું, કે મન મારું ભોળું ભોળું. - **અંત્યાનુપ્રાસ**

1001. શબ્દનો સાચો વિકલ્પ જણાવો. નિગમ. - **અગમ**

1002. રેખાંકિત ક્રિયા વિષેશણનો પ્રકાર જણાવો. શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. - **રીતવાચક**

1003. સંધિ જોડો. હેતુ + આભાસ. - **હેત્વાભાસ**

1004. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લોખંડનું તગારું. - **ટોકર**

1005. છંદનો પ્રકાર જણાવ. ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. - **સ્રગ્ધરા**

1006. શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જંબાલ. - **કાદવ**

1007. સંધિ જોડો. વિ + અતિક્રમ. - **વ્યતિક્રમ**

1008. વિરોધી શબ્દ જણાવો. ઉત્તમ. - **અધમ**

1009. રેખાંકિત ક્રિયા વિશેષણ જણાવો. કિશા ખડખડાટ હસી. - **રીતવાચક**

1010. સંધિ છોડો. નિષિદ્ધ. - **નિ + સિદ્ધ**

1011. સમાસ ઓળખાવો. શૂરવીર. - **દ્વન્દ્વ**

1012. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મરવાની તૈયારીમાં હોય તેવું. - **મુમૂર્ષુ**

1013. છંદનો પ્રકાર જણાવો. લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી ! રાત્રિયે દીર્ઘ તેવી. - **મન્દાક્રાન્તા**

1014. આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. મલયજ. - **સુખડ**

1015. અલંકાર જણાવો. સાટે આજે ગાજે ઓલું હાલરડું. - **શબ્દાનુપ્રાસ**

1016. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વાજ આવી જવું. - **ખૂબ જ થાકી જવું**

1017. રેખાંકિત પદનો કૃદંત પ્રકાર જણાવો. કામિની ખાવાને મહત્ત્વ આપે છે. - **વિધ્યર્થ કૃદંત**

1018. સંધિ જોડો. સત્ + ચારિત્ર્ય. - **સચ્ચારિત્ર્ય**

1019. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નસીબનું બંધન. - **વિધિપાશ**

1020. વિરોધી શબ્દ આપો. અકરાંતિયું. - **મિતાહારી**

1021. રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. અગાઉ અમે માનગઢ આવેલા છે. - **ક્રમવાચક**

1022. આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. 'કેવળ તમારા માન ખાતર હું આવીશ.'- **કેવળ**

1023. અલંકારનો પ્રકાર જણાવો. 'તડકો-છાંયડો રમત રમતા હતા.'- **સજીવારોપણ**

1024. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. 'બાકરી બાંધવી'- **દુશ્મનાવટ કરવી**

1025. રેખાંકિત પદનો કૃદંત પ્રકાર જણાવો. અક્ષય ચાલતાં ચાલતાં કોલેજ ગયો. - **વર્તમાન કૃદંત**

1026. સંધિ છોડો. નિષેધ. - **નિ + સેધ**

1027. સમાસ ઓળખાવો. સચરાચર. - **દ્વન્દ્વ**

1028. છંદનો પ્રકાર જણાવો. તમારા આત્માનો અમર વરણે દીપક ધરો- **શિખરિણી**

1029. 'ભણતા ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય' છંદ ઓળખાવો. - **ચોપાઈ**

1030. 'વાડ થઈને ચીભડા ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે ? ખળ ખાતું હોય જ અન્ન તો જીવ નહી એકે જન.' છંદ ઓળખાવો. - **મનહર**

1031. 'ગાંધીજી હિંસા અને અસત્યના અરિ હતા' અલંકાર ઓળખાવો. - **વ્યાજસ્તુતિ**

1032. 'બીજાના હાથે લખાયેલું જીવનનું વૃતાંત' માટે સાચો શબ્દ આપો. - **જીવનકથા**

1033. 'અજન્મા' ક્યા પ્રકારનો સમાસ છે ? - **અવ્યયીભાવ**

1034. ભાષાના ચાર અંગોમાં ધ્વનિ, રૂપ, પદ અને ચોથું ક્યું ? - **વાક્ય**

1035. 'ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં' પંક્તિનો છંદ ઓળખાવો. - **શાર્દુલ વિક્રીડિત**

1036. હરિણી છંદનું બંધારણ જણાવો. - **નસમરસલગા**

1037. 'તેની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેતો હતો' આ ઉદાહરણ ક્યા અલંકારનું છે ? - **અતિશયોક્તિ**

1038. 'દીવાદાંડી' શબ્દનો સમાસ દર્શાવો. - **મધ્યમપદલોપી**

1039. 'હું અમે', 'તુ- તમે' ક્યા પ્રકારનું સર્વનામ છે ? - **પુરુષવાચક**

1040. 'દહાડે ડોબા ચારે ને રાતે હીરા પારખે.' રૂઢિ પ્રયોગનો અર્થ બતાવો. - **ગુપ્તપણે કામ કરનાર**

1041. 'મિજાજ તરડાવો' રૂઢિપ્રયોગનો **અર્થ શું થાય ? : અભિમાન થવું.**

1042. મો'લાતુ શબ્દનો અર્થ **(શબ્દ-સમજૂતી) દર્શાવો. : મહેલો**

1043. આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. હું <u>ઝડપથી</u> ત્યાં પહોંચી ગયો. : **રીતવાચક**

1044. સંધિ છોડો : નિર્ણય : **નિસ્ + નય**

1045. આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. 'મૂક' : **વાચાળ**

1046. 'ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે' ક્યા **અલંકારનું** ઉદાહરણ છે ? : **રૂપક**

1047. છૂટા પાડેલા સ્વર-વ્યંજનો **(ધ્વનિશ્રેણી) શોધો**. 'અંગરક્ષક' : **અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્**

1048. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. 'ધ્યાના અહીં <u>આવેલ</u> હતી.' : **ભૂતકૃદંત**

1049. આપેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'ઈસ્કોતરો' : **જૂની લાકડાની પેટી**

1050. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હૈયું પાછું આવવું. : **બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું.**

1051. અલંકારનો પ્રકાર શોધો. હું હું છું અને તું તું છે. : **અનન્વય**

1052. શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો : **તંગ**

1053. આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. '<u>કેસરિયાળો</u> સાફો આખું ફળિયું લઈને મહાલે.' : **રંગવાચક**

1054. આપેલ વાક્યનો છંદનો પ્રકાર જણાવો. "હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ' : **દોહરો**

1055. આપેલ વાક્યનો ભાવેપ્રયોગ જણાવો. 'શું કાનજીભાઈ આવશે?' : **શું કાનજીભાઈથી અવાશે?**

1056. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'ગામને પાદર ઘેટાં-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ - : **ઝોકડું**

1057. છંદનો પ્રકાર શોધો. હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો : **શાર્દૂલવિક્રીડિત**

1058. અલંકારનો પ્રકાર જણાવો. ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! : **રૂપક**

1059. છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) શોધો. 'ક્રમબદ્ધ' : **ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ**

1060. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. પરેશ <u>બોલતો</u> હતો. : **વર્તમાનકૃદંત**

1061. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. **સંઘ કાશીએ પહોંચવો : કામ પાર પાડવું**

1062. આપેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) આપો. 'પસાયતો' : **રક્ષક**

1063. પૃથ્વી છંદનું બંધારણ જણાવો. : **જસજસયલગા**

1064. આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. : **સ્થળવાચક**

1065. આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 'જુહાર' : **પ્રમાણ**

1066. આપેલ વાક્યનો કર્તરિપ્રયોગ જણાવો.

રૂપાકાકીની હળ લઈ ખેતરમાં જવાયું : **રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા**

1067. સમાનાર્થી શબ્દ જણાવો - 'રાજીવ' : **સરોજ**

1068. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ધનુષ્યની દોરી : **મૌર્વી**

1069. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો 'પૈહા' : **પૈસા**

1070. 'ડમણી' શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. : **સાદું ગાડું**

1071. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર - : **પલ્લું**

1072. સમાનાર્થી શબ્દ આપો. 'સ્નપિત' : **નવડાવેલું**

1073. છંદના સૂત્રમાં કેટલા ગણ છે? : **આઠ**

1074. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પાંદડાનો ધીમો અવાજ - : **પર્ણમર્મર**

1075. આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

ધોરિયાની કૂણી લીલી ઘ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. : **રંગવાચક**

1076. 'પાગ' શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. : **પાત્ર**

1077. છંદનો પ્રકાર શોધો. ચાલો એવા સ્થલ મહિ, વસે સૂર્ય જેમાં સદૈવ! : **મન્દાક્રાન્તા**

1078. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.

પ્રજવલ ગોધરા આવનાર છે. : **ભવિષ્યકૃદંત**

1079. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

નાટક ભજવવું : **હકીકત છૂપાવવા ઢોંગ કરવો.**

1080. અલંકાનો પ્રકાર શોધો. રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો. : **ઉપમા**

1081. 'દયિત' શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. : **પ્રિય**

1082. છંદનો પ્રકાર શોધો. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી : **હરિગીત**

1083. આપેલ વાક્યનો પ્રેરક શોધો. ખેડૂતો મહુડાં વીણી લે છે. : **ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે.**

1084. આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. મારી વાત ખરી ને! : **ને**

1085. 'ચૂવું' શબ્દનું તળપદા શબ્દનું શિષ્ઠ રૂપ શોધો. : **ટપકવું**

1086. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હરિના ચરણનું પવિત્ર જળ - : **હરિપાદોદક**

1087. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ટીંબો બની જવું. : **ખેદાનમેદાન કરી નાખવું.**

1088. આપેલ વાક્યનો કર્તરિપ્રયોગ જણાવો. સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું : **સારું થયુ કે સુહાસભાઈ છૂટી ગયા**

1089. 'ઠહવા રહેવું' શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. : **સમસમી જવું**

1090. આપેલ વાક્યનો કર્મણિપ્રયોગ જણાવો. ઈશ્વર પાપની સજા કરતો હતો : **ઈશ્વરથી પાપની સજા કરાતી હતી**

1091. આપેલ વાક્યનો કર્તરિપ્રયોગ જણાવો. મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? : **મોરના ઈંડા કોણ ચીતરે છે ?**

1092. 'હિમસુતા' શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. : **હિમાલયમાંથી નીકળતી નદી**

1093. 'ઘરવટ' શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. : **ઘર જેવા સંબંધવાળું**

1094. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર : **ભંડારી**

1095. છંદનો પ્રકાર શોધો.

નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી

વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે : **મનહર**

1096. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે. : **ભૂતકૃદંત**

1097. આપેલ વાક્યનો ભાવે પ્રયોગ જણાવો. વિહાન ખાય છે : **વિહાનથી ખવાય છે**

અંગ્રેજી ગ્રામર

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. He was ....Napoleon of his age.
A) a B) the C) an D) none
2. Find the Nearest meaning of Devour
A) Came off B) Eat greedily C) All Types D) Eat crowdly
3. The Cheif, with all his subordinates, ...massacred.
A) were B) have been C) was D) are
4. Forty thousand rupees.......a large sum.
A) are B) is C) were D) been
5. ....water runs always deep.
A) Still B) Steal C) Stil D) Steel
6. Vote and ....for me, Please.
A) canvass B) cenvass C) canvaas D) canvase
7. I cannot.........to your request.
A) axcid B) acseed C) accede D) exseed
8. Find the appropriate option for the underlined part:
He was reared by his uncle and aunt.
A) Grown by B) Brought up
C) Back-viewed D) grew up
9. Give the adjective form of 'Enemy'
A) Enimical B) Enmity C) Inimical D) Enemical
10. Fill in the gap
Oxygen : Burn :: Carbon dioxide :
A) Isolate B) Foam C) Extinguish D) Explode
11. The moon has hid......face behind a cloud.
A) his B) her C) its D) my
12. The antonym of 'Democracy' is..........
A) Autocracy B) Presidcncy C) Theocracy D) Secular
13. Find the correct spelling of the word for 'Generations'.
A) Contemporaries B) Contemprories
C) Contamporaries D) Contemspraries
14. The statue was........with leaves of gold.
A) golded B) gilded C) guilded D) goldded
15. He is blind. He can see with.........of his eyes.
A) neither B) either C) both D) any
16. He put on a new shirt yesterday,............he ?
A) dosen't B) didn't C) did D) hasn't
17. They..............a new business for five years.
A) have been starting B) have started
C) started D) did started
18. When I was a child, I ....under this banyan tree.
A) were playing B) have been playing
C) had been Playing D) were Played
19. You..........permission of your parents before taking such an important dicision.
A) should have seek B) should sick
C) should have sought D) should have saught
20. select the most opposite word in meaning to 'inadvertently'
A) Sansibly B) indifferently
C) Knowingly D) Unwittingly
21. Find the correct spelling for a respiratory disease.
A) Neumonia B) Numonia
C) Pneumonia D) Pnumoniya
22. Pintu is an.........child with a violent temper.
A) obedient B) obstinate C) honourable D) obeying
23. Find the nearest meaning of 'Embrace'
A) Exclude B) Throw out C) Turn out D) include
24. ....is a word which expresses some sudden feelings.
A) A conjunction B) A preposition
C) A noun D) An interjection
25. Ours is a ....school
A) girls B) girls' C) girl's D) boys
26. My uncle lives in the ....house.
(Use the Proper form of nigh)
A) next B) nigher C) Near D) nearest
27. Both the tiger and the leopard are cats, the former animal is much larger than the.........
A) later B) letter C) latter D) laiter
28. ....friends he has are all poor.
A) Few B) A Few C) Fewer D) The Few

રેવન્યૂ તલાટી - 28/02/2016

29. Give the first Verb form of : bereft
A) bereave B) bear C) barefoot D) beareve
30. Select single word for the following phrase :
"Government based on religion"
A) Diarchy B) Theocracy C) Plutocracy D) Aristocracy
31. Give opposite gender for : 'Bullock"
A) heifer B) bully C) calf D) colt

1)B, 2)B, 3)C, 4)B, 5)A, 6)A, 7)C, 8)B, 9)C, 10)C, 11)B, 12)A, 13)A, 14)B, 15)A, 16)B, 17)B, 18)C, 19)C, 20)C, 21)C, 22)B, 23)D, 24)D, 25)A, 26)A, 27)C, 28)D, 29)A, 30)B, 31)A.

32. Select single word for the following phrase :
"That which cannot be rubbed off"
A) Incredible B) Indelible C) Inedible D) Irrubbable

33. Change into passive voice :
They asked me my name.
A) My name is asked by them
B) I asked my name by them
C) I was asked my name by them
D) I am asked my name by them

34. Find correct spelling.
A) etiquete B) ettiquette C) etiquette D) ettiquete

35. Give plural form of : 'index (sign in algebra)
A) indices B) indexese C) indesis D) indexis

36. Put Proper Question tag :
Everyone stood up,...................?
A) didn't they B) did he C) wasn't he D) were they

37. My work..............over, I rushed out to play cricket.
A) has been B) had being C) have been D) having been

38. Both the tiger and the leopard are cats; the former animal is much larger than the................ (late)
A) latter B) later C) letar D) letter

39. Change the degree :
Ashoka was one of the greatest kings.
A) No other king was so great as Ashoka.
B) Very few kings were as great as Ashoka.
C) Ashoka was greater than any other king.
D) Some other kings were as greater as Ashoka.

40. Give the Noun form of : dig
A) digation B) ditch C) digestion D) digth

41. The novelist and poet...........dead.
A) are B) were C) is D) have

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

42. God...........those who love the poor poeple.
A) loves B) love C) loving D) loved

43. His ears.........to know about his result.
A) will being burned B) were burning
C) will burn D) all the three

44. Turn into active voice - 'Ugly ducklings have to be found by you.
A) you have found Ugly ducklings.
B) you have to find Ugly ducklings.
C) you have to been find Ugly ducklings.
D) you have to been found Ugly ducklings.

45. I am going to buy some vebtables- add question tag.
A) ainn't B) am I C) is I D) ain't I

46. While targeting the goal of life, he met..........triumph and disaster.
A) after B) with C) whirlst D) for

47. I want to learn french language from the person........is experienced.
A) what B) which C) who D) all the three

48. He is utmost confident and sure..............succeed.
A) with B) by C) to D) none of above

49. ....a rich fellow, he never helps needy people.
A) Being B) Be C) Became D) Become

50. He cooked food for the family........it was midnight.
A) till B) instead of C) rather D) by

51. No sooner..............call him than he shouted.
A) am I B) had I C) did I D) was I

52. We shall play cricket...............it rains.
A) so B) that C) while D) when

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

53. The PM insisted ....discipline.
A) after B) on C) in D) into

54. She fell while.............
A) Jumped B) jump C) jumps D) jumping

55. ....money do you spend on books ?
A) How B) How often C) How many D) How much

56. The patient is too weak...........
A) walks B) to walk C) walk D) walked

57. Assam is in ....East of our country.
A) the B) to C) a D) an

58. ....only thing you missed is his lecture.
A) The B) Few C) An D) A

59. One of my friends................a doctor.
A) were B) will C) is D) are

60. When the manager came, they..........the task.
A) finishing B) had finished
C) finished D) have finished

61. She played ....her friend.
A) more good B) so good
C) good as D) better than

62. ....comment on demonetization ?
A) Each B) Ever C) A little D) Any

63. Hardly had I got up.......she came.
A) while B) when C) then D) than

32)B, 33)C, 34)C, 35)A, 36)A, 37)D, 38)A, 39)B, 40)B, 41)C, 42)A, 43)B, 44)B, 45)D, 46)B, 47)C, 48)C, 49)A, 50)A, 51)C, 52)D, 53)B, 54)D, 55)D, 56)B, 57)A, 58)A, 59)C, 60)B, 61)D, 62)D, 63)B.

તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ

64. They drew a circle in the morning. - Change the voice.
A) A circle was drawn by them in the morning.
B) in the morning a circle was being drawn.
C) A circle was being drawn by them in the morning.
D) A circle has been drawn since morning.

65. Suketu has no pen.........
A) to write be B) to write for
C) to write with D) to write in

66. The police made him ....his crime.
A) confesses B) to confess C) confess D) confessed

67. He will not object ....my proposal.
A) to B) into C) in D) at

68. I think I.........this article.
A) had been reading B) would read
C) read D) have read

તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ

69. When Amitabh returned to the cinema, much water .... been flown.
A) had B) did C) has D) have

70. Find a correct statement.
A) Raja has liked to play hockey
B) Raja was liking to Play Hockey
C) Raja likes to Play Hockey
D) Raja is liking to Play Hockey

71. ....a beautiful picture it is !
A) When B) where C) How D) What

72. She is the...........person in our village.
A) very beautiful B) quite beautiful
C) most beautiful D) beautiful

73. Ashutosh does not think...........this tricks will work.
A) were B) what C) that D) those

74. You are the man ....our professor respects the most.
A) how B) what C) who D) whom

75. I am fond ....reading.
A) of B) on C) in D) at

76. Raghu works in the office as if he.............a boss.
A) is B) are C) was D) were

77. One of the men................the culprit from that mob.
A) am B) is C) are D) were

78. The girl.........at the door is my sister.
A) is standing B) standing C) stand D) standed

79. Please................ the door.
A) shutted B) shuting C) shut D) shutt

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

80. I really enjoy.......the poor.
A) helped B) will help C) help D) helping

81. The plane took of.............Mumbai airport.
A) from B) at C) in D) on

82. Find the meaning of underlined word. 'We <u>hoped</u> to visit a zoo but we visited museum.'
A) jumped B) started C) wanted D) walked

83. He has improved his performance by...............again and again.
A) talked B) talk C) practised D) practising

84. To run ofer someone is to..............
A) race B) marathon C) chase D) follow

85. A contry ruled by a king is..............
A) kingrule B) Kingdom C) courtyard D) State

86. I had..............headeche in the morning
A) keen B) very C) severe D) bed

87. kusum's father was ....London last month.
A) had B) gone C) in D) from

88. Give nearest meaning : Appear
A) See B) Reach C) Happen D) Show

89. Find nearly opposite meaning : Prosperity
A) Poverty B) Disparity C) Improper D) Ability

90. Give nearest meaning : Messenger
A) A soldeir B) Vriter
C) A slave D) A news carrier

91. We Should not smoke because..................
A) smoking kills B) none of three mentioned here
C) smoking created pollution D) smoking is injurious to health

92. Find nearly opposite meaning : Monarchy
A) Freedom B) strong rule C) kingdom D) democracy

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

93. .... you are ill, I will act for you.
A) Since B) Because of C) Oweing D) Due to

94. Only you and...........can do this work.
A) him B) her C) I D) me

64)A, 65)C, 66)C, 67)A, 68)D, 69)A, 70)C, 71)D, 72)C, 73)C, 74)D, 75)A, 76)D, 77)B, 78)B, 79)C, 80)D, 81)A, 82)C, 83)D, 84)C, 85)B, 86)C, 87)C, 88)D, 89)A, 90)D, 91)D, 92)D, 93)A, 94)C.

95. The abstract noun of young is ....
A) youngster B) Youth C) younger D) youngman

96. Rahul said that he was not averse..............the idea.
A) in B) for C) of D) to

97. My income is.............that of yours.
A) lesser than B) as little as
C) less to D) less than

98. The negative of : He is too dull to understand it.
A) He is not too dull to understand it.
B) He is so dull that understand it.
C) He is so dull that he cannot understand it.
D) He is not too dull to understand it.

99. નીચેનામાંથી અજાણી વ્યક્તિ માટે વપરાતો શબ્દ શોધો.
A) thief B) jeweler C) stranger D) passenger

100. Thinkનું ભૂતકાળ લખો.
A) Thank B) thinked C) thought D) thinking

101. Valley શબ્દનો ગુજરાતી શબ્દ લખો.
A) ખાડો B) નદી C) સાગર D) ખીણ

102. He is the man..............I know, you can trust completely.
A) whom B) whose C) who D) which

103. Give the adjective form of prevent.
A) prevention B) preventive C) preventful D) preventous

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

104. Neither the man nor his wife ....at home yesterday.
A) is B) are C) was D) were

105. Which sentence is wrong ?
A) I shall show you the way. B) I have shown the way.
C) I shown you the way D) I must show you the way.

106. What does a dentist do to a bad tooth ?
A) takes it off B) takes it in
C) takes it away D) takes it out

107. Raju was suspended.........
A) in order to his regularity B) inspite of his regularity
C) because of his regularity D) due to his regularity

108. here is the cupboard ....
A) by which he has taken out the paper
B) on which he has taken out the paper
C) in which he has taken out the paper
D) from which he has taken out the paper

109. Bhagwandas, desiring ....a lot of money, went to London.
A) to be earned B) earned
C) to earning D) to earn

110. My handwriting is better than..............
A) her B) hers C) her's D) hers'

111. Very few actresses were ....Madhubala.
A) mora talented B) the most talented
C) so talented as D) less talented than

112. Replace the underlined part with correct option
We are greatly <u>exhausted</u> after driving for hours together.
A) bored B) extinguished
C) enlighted D) tired

113. Which means the same as approch
A) to go round B) to go out
C) to go towards D) to go down

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017)

114. Manhar is the person .... is taking over my job next week.
A) who B) what C) how D) which

115. Kundan couldn't imagine ....he would be able to find the courage to fight.
A) what B) how C) which D) where

116. By six o'clock tomorrow, I'LL..............finished my report.
A) has B) been C) have D) may

117. He doesn't seem to be here. He...............out.
A) must have gone B) must be going
C) must go D) must have been going

118. My parents have been married .... forty-nine years.
A) since B) for C) until D) till

119. My fingers were injured so my sister had to write the note .... me.
A) for B) with C) to D) from

120. The baby............... soundly even when the............... next door play noisily.
A) sleep, childs B) sleeps, children
C) sleeps, child D) sleep, children

121. We were not alone in the room. He sat ________ me. There were others there______us.
A) be, besides B) besides, beside
C) next, between D) by, besides

122. By the time we reach there, the store_______(close).
A) will close B) will have closed
C) closed D) were to close

95)B, 96)D, 97)D, 98)C, 99)C, 100)C, 101)D, 102)A, 103)B, 104)C, 105)C, 106)D, 107)B, 108)D, 109)D, 110)B, 111)C, 112)D, 113)C, 114)A, 115)B, 116)C, 117)A, 118)B, 119)A, 120)B, 121)D, 122)B.

Choose the word/phrase that best connects the sentences.

123. We should be doing something about this. We are doing nothing.

A) Moreover B) On the contrary
C) Next D) Lastly

124. The historical sciences have made us very conscious of our past. Some scholars tend to study this.

A) For this reason B) For no reason
C) Finally D) Similarly

125. The computer was originally designed for complicated calculations in the 1930s. It became a part of our lives.

A) Henceforth B) Later C) Because D) Albeit

126. Ambiguity of thoughts can lead to disaster.

A) Rigidity B) confusion C) certainty D) rationality

Use a phrasal verb closed in meaning to the words given in the brackets. (Q. 159-161)

127 It's too cold in here. Shall I _________(increase the temperature) the heating?

A) get up B) turn up C) turn on D) put on

128. What does this word mean? I'll ______ it ______ (find its meaning) in the dictionary.

A) look, up B) look, in C) look, out D) look, for

બિન સચિવાલય ક્લાર્ક - 2016

129. Fill in the blank.

adjective form of enemy is............

A) enemity B) enimical C) inimical D) enimic

130. Verb form of 'poor' is...........

A) to poorise B) poorly
C) to impoverish D) poverty

131. નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.

(1) Epitaxy (2) Episode (3) Epigene (4) Epitome

A) 1,2,3,4 B) 3,2,4,1 C) 3,2,1,4 D) 4,2,1,3

132. Find correct spelling :

A) Perseverence B) Perseverance
C) Perseveranse D) Parseverence

133. Put proper article.

.... little information he had was not quite reliable.

A) A B) An
C) The D) Article not required

134. Match offisprings of animals :

1) Ass a) Colt/filly
2) Hare b) foal
3) Stag c) fawn
4) Horse d) Leveret

A) 1-a, 2-b, 3-c, 4-d B) 1-d, 2-b, 3-a, 4-c
C) 1-b, 2-c, 3-a, 4 d D) 1-b, 2-d, 3-c, 4-a

135. Feminine gender of 'Bachelor' is ....

A) Student B) Merried C) Spinster D) Girl

136. Fill in the blank.

Come ...., please.

A) hear B) their C) hither D) A and B both

137. Give synonym of : Contemplate

A) Condemn B) Meditate
C) Menuplate D) None of (A), (B) and (C)

138. Give a single word for :

'A place where dead bodies are kept before burial or cremation'

A) Arsenal B) Creche C) Asylum D) A mortuary

139. Fill in the blank.

Go back..............you came.

A) where B) thence C) whence D) why

140. Fill in the blank.

A true.................is one who keeps one's country's secret to oneself.

A) confident B) confidunt C) confidant D) A conffident

141. Fill in the blank.

.................i in his place, I would not do it.

A) Am B) Was C) Had D) Were

142. Fill in the blank.

He, as well as his friends..........to my place everyday.

A) are coming B) comes C) come D) were coming

143. Give plural form of 'man-servant'

A) Man-servants B) Men-servant
C) Men-servants D) Mans-servants

144. Fill in the blank.

He has been living in Bombay.................last ten years.

A) for B) by C) since D) before

145. Who taught you French ?(Change the voice)

A) By whom were you taught French ?
B) Who was taught French by You ?
C) By whom was eFrench tought to you
D) Whom did you teach French ?

123)B, 124)A, 125)B, 126)C, 127)B, 128)A, 129)C, 130)C, 131)C, 132)B, 133)C, 134)D, 135)C, 136)C, 137)B, 138)D, 139)C, 140)C, 141)D, 142)B, 143)C, 144)C, 145)A.

146. Change the degree :
'He plays better than Rohan'
A) Rohan plays as well as he.
B) Rohan does not play so well as he.
C) He does not play so good as Rohan
D) Rohan plays as good as he.

147. Make exclamatory sentence.
'It is a great pity.'
A) What a pity ! B) What a great pity is it !
C) How pity is it ! D) How grat it is !

148. Fill in the blank.
Everybody likes................simplicity.
A) childist B) childish C) childlike D) childs

149. Fill in the gap.
Car : Garage :: Aeroplane ....
A) Port B) Depot C) Hangar D) Harbour

150. Fill in the gap.
Our freedom fighters had .... many hardships.
A) born B) borne C) bourn D) bourne

151. Fill in the blank.
I shall punish you .... you confess your fault.
A) if B) whether C) unless D) but

152. Select Past form of 'to tread'
A) trode B) trod C) troden D) trodden

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

153. Both the friends were idle .... of them stood up to answer.
A) Neither B) Either C) Each D) All

154. Do you know under .... leadership we won freedom ?
A) which B) whom C) whose D) who

155. Find the correct spelling.
A) perseverence B) perseverance
C) perseveranse D) parseverence

156. The person who conducts sales at which goods are sold to the persons making the highest bid or offer is called ....
A) conjurer B) bursar C) chairman D) auctioneer

157. Find correct spelling.
A) buckey B) bouquet C) booket D) booquet

158. A person's life history written by some other person.
A) biography B) autobiography
C) geography D) biolife

159. .... people are smart enough not to be cheated.
A) Urban B) Urbune C) Urbun D) Urbene

160. Throw this pen .... the dustbin.
A) in B) in to C) on D) none

161. Give plural form of : 'sheep'
A) sheep B) ships C) sheeps D) sheepses

162. The cattle .... grazing in the field.
A) am B) is C) are D) was

163. Give plural form of : 'Hypothesis'
A) Hypotheses B) Hypothisis
C) Hypothysis D) Hypothises

164. Pick out the odd word form :
A) dentist B) doctor C) pupil D) engineer

165. Imam Husain died .... a noble cause.
A) of B) for C) in D) at

166. A black smith uses ....
A) drili B) plane C) trowel D) bellows

167. Find out the material noun.
A) Folk B) Army C) Team D) Gold

168. Rohan was .... till death by the decoits.
A) hanged B) hung C) hunging D) hunged

169. He said 'I shall go as soon as it is possible.'
(Turn into Indirect speech)
A) He said that he should go as soon as that was possible.
B) He said that he would go as soon as it was possible.
C) He said that he shall go as soon as it is possible.
D) He said that he will go as soon as that was possible.

170. Make exclamatory sentence of; 'They are very hard working people.'
A) How hard working people are they !
B) What hard working people are they !
C) What hard working people they are !
D) How a hard people they are !

171. Our teacher told us that knowledge is power. (Change the voice)
A) We were told by our teacher that knowledge is power.
B) It is told by our teacher that knowledge shoulde be power.
C) It is told by our teacher that knowledge must be power.
D) It is told by our teacher that knowledge could be power.

146)B, 147)A, 148)C, 149)C, 150)B, 151)C, 152)B, 153)A, 154)C, 155)B, 156)D, 157)B, 158)A, 159)A, 160)B, 161)A, 162)C, 163)A, 164)C, 165)B, 166)D, 167)D, 168)A, 169)B, 170)C, 171)A.

172. .... do you think, will get the first prize?
A) Who B) Whom C) Whose D) How

173. Translate the following sentence in English :
હું હજી મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ ?
A) I have been in a confusion yet, whether science is a boon or curse.
B) I am confused that science is boon or curse.
C) I were confusion that science is boon or curse.
D) I yet was confusion that science is boon or curse.

174. A bunch of bananas was .... from the ceiling.
A) hanged B) hung C) hanging D) hunged

175. Translate the following sentence in English :
તમારે તમારૂં વચન પાળવું જોઈએ.
A) You must keep your promise
B) You keep your promises.
C) You will keep promises.
D) You must tame your promise.

176. ';' called ....
A) comma B) colon
C) semicolon D) inverted comma

PSI ખાતાકીય - 23/04/2017

177. નીચે ચાર અંગ્રેજી શબ્દો આપવામાં આવ્યા છે. તેમાનો ક્યો શબ્દ ડિક્ષનરી મુજબ ગોઠવતાં ત્રીજા ક્રમે આવશે ?
A) Unimportant B) Unserstand
C) Unneessary D) unethical

178. નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોષના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.
1. Epitaxy 2. Episode 3. Epigene 4. Epitome
A) 1, 2, 3, 4 B) 3, 2, 4, 1 C) 3, 2, 1, 4 D) 4, 2, 1, 3

GPSC Class-1 - 2016

179. If I feel stressed, I find taking a bath is ofton ....
A) relaxed B) relaxing C) had relaxed D) have relaxed

180. My sister is not .... intelligent .... my brother.
A) so, as B) either, or C) neither, nor D) as, so

181. This is a small .... interesting story.
A) and B) or C) but D) if

182. Where .... they go yesterday ?
A) do B) does C) did D) were

183. Tell me, ... you coming to the party ?
A) would B) are C) will D) was

184. He was accused .... theft.
A) of B) for C) with D) on

185. We regret that we cannot comply .... your request.
A) at B) with C) to D) for

186. .... man is mortal.
A) A B) An
C) The D) No article is needed

GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

187. They are studying .... three hours today.
A) Since B) for C) last D) at

188. He agreed .... my demands.
A) to B) with C) on D) in

189. There aren't .... apples in the basket.
A) some B) few C) any D) much

190. I .... leave now. It is too late
A) may B) shall C) should D) must

191. We .... arrived in Gujarat by the time you get this letter.
A) will had B) will have C) had been D) have been

192. She spoke .... than he did.
A) quicker B) more quickly
C) most quickly D) quick

193. Rohan plans .... abroad next year.
A) Studying B) to study C) study D) to studying

194. They .... leave, did they ?
A) do B) did C) will D) didn't

195. Unless he ...., he would be at work.
A) were ill B) wasn't ill C) was ill D) would ill

196. One Monday, ... unarmed man stole gold chain from .... jewelry shop, ... thief hasn't been caught yet.
A) an, a, a B) an, an, an C) an, a, the D) an, the, a

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

197. Ram asked me to keep this secret ....
A) in myself B) as secret
C) amongst us D) between us

172)A, 173)A, 174)B, 175)B, 176)C, 177)A, 178)C, 179)B, 180)A, 181)C, 182)C, 183)B, 184)A, 185)B, 186)D, 187)B, 188)A, 189)C, 190)C, 191)B, 192)B, 193)B, 194)D, 195)C, 196)C, 197)D.

198. In India the talent is prodigious, and it increases ....

A) each year B) year by year
C) annually D) progressively

GPSC Class - 1 - 28/01/2017

199. Fill in the blank with appropriate preposition -
He Jumped ....the river.
A) in B) on C) into D) at

200. Fill in the Blank -
.................bird in the hand is worth two in the bush.
A) A B) The
C) No articlw is required D) An

નાયબ ચિટનીશ - 02/06/2015

201. ....river in India is so long as the Ganga.
A) No other B) Many C) Any other D) All

202. Run, our principal..........here.
A) comes B) coming C) came D) is coming

203. At present, she is not going.........library.
A) at B) on C) to D) up

204. ....did the family members go yesterday?
A) Where B) When C) Why D) Whose

205. Raju, carry.........my orders without arguments.
A) on B) away C) out D) near

206. She has a vacation ....today.
A) for B) from C) since D) of

207. Follow the principle, "Do it.......... ."
A) myself B) themselves C) himself D) yourself

208. Kumar is .... B.A. of the M.S.University.
A) a B) the C) an D) few

209. Where ....they.......tomorrow?
A) will + go B) do + go C) shall + go D) did + go

210. Do you know who ..........T.V.?
A) inventor B) invention C) invented D) invently

211. When father returned, we ....
A) played B) were playing
C) was played D) are playing

212. Cancer is still ....
A) curable B) sufficient C) incurable D) capable

213. Tomorrow my bicycle ....by any one.
A) stolen B) was stolen C) is stolen D) will be stolen

214. The Taj Mahal ....by Shahjahan.
A) is built B) was built C) are built D) were built

215. Gujarat is ....for its cotton industry.
A) fame B) familiar C) famous D) family

216. ....is the minister absent today?
A) When B) Who C) Why D) Whom

217. Katrina and ....read together.
A) I B) mine C) me D) her

218. After sometime he came out ....the street.
A) in B) on C) to D) over

219. Who is older .... you two?
A) among B) from C) between D) on

220. My parents .... at 5:30 a.m. daily.
A) get-up B) gets up C) got-up D) is get up

221. Choose the correct pronoun for the underlined part.
<u>The farmers</u> are going to their farms.
A) We B) They C) Them D) You

222. Wait here till you......... .
A) is called B) were called C) called D) are called

223. ....students never disobey their teachers and elders.
A) Obey B) Obedience C) Obedient D) Disobey

224. Roma is ....than Ram.
A) taller B) tallest C) tall D) the tallest

225. Replace the underlined part of the following sentence with appropriate option.
<u>These days</u> every country is afraid of terrorism.
A) At last B) At present C) At least D) At past

226. Can anyone...........two masters?
A) be served B) is serving C) serve D) served

227. Walk fast..........you will miss the bus.
A) and B) otherwise C) but D) so

228. Choose the correct pronoun for the underlined part.
<u>The cows</u> are under the trees.
A) you B) Their C) Them D) They

229. We wish her ....a marriage function.
A) to attend B) has attended C) attending D) was attended

230. ....dogs seldom bite.
A) Barked B) Bark C) Barks D) Barking

231. The officer gave him ....stamps.
A) using B) is used C) used D) was used

198)B, 199)C, 200)A, 201)A, 202)D, 203)C, 204)A, 205)C, 206)B, 207)D, 208)A, 209)A, 210)C, 211)B, 212)C, 213)D, 214)B, 215)C, 216)C, 217)A, 218)C, 219)C, 220)A, 221)B, 222)D, 223)C, 224)A, 225)B, 226)C, 227)B, 228)D, 229)A, 230)D, 231)C.

નાયબ ચિટનીશ - 05/02/2017

232. All.........international. flights..........because of smog. (Fill in the blanks)
A) the, have been cancelled B) the, went
C) an, gone D) an, flies

233. She shut the doors..................?
A) didn't she B) hasn't she C) isn't she D) doesn't she

234. ....is Dwarika ....Somnath ? (Fill in the blanks)
A) How far, from B) How much, to
C) How, on D) How long, to

235. Only.........books are left now, we still need ....more books. (Fill in the blanks)
A) a few, a little B) a few, some
C) few, little D) little, little

236. Only ....Guru Govindsinh can fight for ....national pride. (Fill in the blanks)
A) the, the B) a, the C) the, a D) a, a

237. I know what .... in the court tomorrow. (Fill in the blank)
A) can he say B) he will say
C) did he say D) will he say

238. In any case, you ....to perform this task. (Fill in the blank)
A) will B) will have C) did have D) do

239. As soon as we finished our work, the guests .... (Fill in the blank)
A) will arrive B) arrive C) arrival D) arrived

240. ....She.........a new car on last Rathyatra ? (Fill in the blanks)
A) Did, buy B) Had, buy C) Does, buy D) Will, buy

241. No sooner did we ....the market, it ....raining. (Fill in the blanks)
A) enter, started B) went, start
C) go, start D) entered, start

242. Can you follow what he is saying ? Yes, ... (Fill in the blank)
A) he can B) we could C) I did D) I can

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

243. pick the correct meaning of the word 'rectify'
A) Proceed B) Satisfy C) interest D) Correct

244. Find the Word with correct Spelling.
A) recieve B) receive C) receeve D) resieve

245. Choose the opposite word for 'consensus'
A) accept B) opinion C) disagreement D) permission

246. The parents are <u>in high spirits</u> as their son has got adecent job. What is the meaning of the <u>idiom.</u>
A) in good position B) sad
C) Cheerful D) shocked

247. The work you have submitted is not.........mark.
A) as the B) from the
C) up to the D) no improvement

248. Time after twilight and before midnight is .
A) evening B) dawn C) dusk D) eclipse

249. Which word is spelt wrong ?
A) lugage B) privilege C) fatigue D) tariff

250. The outgoing committee handed .....all the documents to the new member.
A) upon B) into C) over D) in

251. Sorry, you can't borrow my pencil, I.........it myself.
A) was using B) using C) use D) am using

252. What time........
A) the train Leaves ? B) leaves the train ?
C) is the train leaving ? D) does the train leave ?

253. Which word is a pronoun in the following sentence - 'Do you ever need to give request ?'
A) ever B) give C) request D) you

254. Replace the underlined words to make it grammatically correct ?
The small child does whatever his father <u>was done.</u>
A) has done B) did C) does D) had done

255. I saw a .....of cows in the field.
A) group B) herd C) swarm D) flock

256. Success in examination depends .....hard work done.
A) at B) over C) for D) on

257. To err is ....to forgive divine.
A) beastly B) human C) inhuman D) natural

258. The rulling party will have to put its own house ....order.
A) in B) on C) to D) into

259. 'brief' નું synonyms
A) limited B) small C) little D) short

260. 'Embezzle' means :
A) Misappropriate B) balance
C) remunerable D) clear

232)A, 233)A, 234)A, 235)B, 236)B, 237)B, 238)B, 239)D, 240)A, 241)A, 242)D, 243)C, 244)B, 245)C, 246)C, 247)C, 248)C, 249)A, 250)C, 251)D, 252)D, 253)D, 254)C, 255)B, 256)D, 257)B, 258)A, 259)D, 260)A.

261. The nearest meaning of 'by far' ....

A) Very near B) more than C) less D) very far

262. The adjective of 'Value'.

A) Values B) Valuation C) Valued D) Valuable

263. Use Suitable verbs : 'If you boil water it slowly ....

A) evaporated B) evaporating

C) evaporate D) evaporates

264. 'The pan was scalding hot.' - In the given sentence scalding is ....

A) punctuation B) adverb of degree

C) adverb of certainty D) pronoun

265. 'She is climbing a tree' - Find the verb.

A) she B) climbing C) is D) tree

266. 'I love my country and I am proud of its rich and varied heritage.' - Meaning of heritage :

A) Something handed down from the past

B) Rotation

C) Point of concentration

D) Movement

267. 'He is as fat as me.' - Find the adjective.

A) as fat as B) as me C) fat D) He is

268. 'Promote harmony and the spirit of common brotherhood amongst the people of India transcending all religion.' - Meaning of transcending :

A) to rise above B) to remove

C) to be with D) drown

269. 'The tall girl in the pink dress is getting into the bus.' - In the given sentence tall is :

A) verb B) adjective C) pronoun D) noun

270. 'Why are you standing in the queue ?' - Find the present continuous verb.

A) queue B) why are you C) standing D) you standing

271. Past tense of 'Stand'.

A) Standing B) Standard C) Standed D) Stood

272. Shri Vijay Rupani is the CM of Gujarat, ... government is in power.

A) whose B) whom C) which D) who

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

273. Fill in the blank with suitable pronoun : "This is not your car. This is ...."

A) All three mentioned here B) mine

C) my D) me

274. Find the correct spelling.

A) Embbarasing B) Embarassing

C) Embarrasing D) Embarrassing

275. Identify the type of adjective : 'Ankita is tired after so much work.'

A) All three Mentioned here B) Descriptive adjective

C) Possessive adjective D) Demonstrative adjective

276. Find the correct spelling.

A) Absord B) Abscard C) Abserd D) Absurd

277. Which of these, is an abstract noun ?

A) All three mentioned here B) soldier

C) Rupees D) Honesty

278. Fill in the blank with modal auxiliary : 'You .... wait outside.'

A) need B) ought to have

C) must D) dare

279. Identify the kind of sentence : 'Try that one.'

A) Interrogative B) Assertive

C) Exclamatory D) Imperative

280. Identify the odd one out from the below words.

A) New B) Ancient C) Remote D) Old

281. Fill in the blank with correct spelling : "Do not .... me."

A) disapointe B) disappoint C) disapoint D) dissapoint

282. Fill in the blank with proper form of verb : "He did not........... his friend."

A) forgived B) forgive C) forgave D) forgiven

283. Choose the correct possessive and fill in the blank : "Do you know .... mother ?"

A) Sanjays' B) Sanjay C) Sanjay' D) Sanjay's

284. Fill in the blank with conjuction : "People love him .... he is helpful."

A) because B) if C) Still D) only

261)B, 262)D, 263)D, 264)B, 265)B, 266)A, 267)C, 268)A, 269)B, 270)C, 271)D, 272)A, 273)B, 274)D, 275)B, 276)D, 277)D, 278)C, 279)D, 280)C, 281)B, 282)B, 283)D, 284)A.

PSI English - 04/05/2015

Identify the Correct sentence

285. A) He returned from Yemen last night.
B) He returns from Yemen last night.
C) He has returning from Yemen last night.
D) He can return from Yemen last night.

286. A) She was been waiting for one month to get her ID card.
B) She waited for one month to get her ID card.
C) She is being waiting for one month to get her ID card.
D) She had waiting for one month to get her ID card.

287. A) The man which works at the Ticket counter is busy.
B) The man which is working at the Ticket counter is busy.
C) The man who works at the ticket counter is busy.
D) The man who were working at the Ticket counter is busy.

288. A) I have been working here as per 2 years
B) I came here in 2 years time
C) I was been working here about 2 years
D) I am working here for the past 2 years

289. A) He flies with a kite B) He was flown a kite
C) He is flying a kite D) He has fly a kite

290. A) The text had been translated incorrectly
B) The text had translation incorrectly
C) The text was to translated incorrectly
D) The text had been translate incorrectly

Sentence completion by using appropriate word

291. A man remains narrow minded, self complacent and ignorant unless he visits other people and ________ from them.
A) Hears B) Earns C) learns D) Borrows

292. I can _______ on him when I have some problem.
A) Bear B) Belief C) count D) Trust

293. It is impossible for an over-worked mother to _______ with so many screaming children.
A) Live B) Deal C) cope D) Continue

294. I have _________ for one week's leave
A) Reserved B) requested C) Ordered D) Maintained

295. Time once lost cannot be_______.
A) gained B) Re-done C) Employed D) Exchanged

296. I have often ________ why she went to live abroad
A) puzzled B) amazed C) wondered D) engrossed

297. The medicine gave him a ________ from suffering
A) pain free B) release C) respite D) rapport

Substitute with the correct word

298. One who specializes in birds
A) Biologist B) Ornithologist
C) Naturalist D) Meteorologist

299. People in a riot
A) Crowd B) Rabble C) Mob D) Congregation

300. To congratulate someone in a formal manner
A) Solemnize B) Facilitate C) Felicitate D) Celebrate

301. Both Buddha and Mahavira lived at the same time.
A) Simultaneous B) Contemporary
C) Coincident D) Synchronized

302. Amar impressed everyone with his <u>fluent and impressive</u> speech.
A) Lecture B) discourse C) Expression D) eloquent

303. The farmers are <u>looking forward</u> for a good rain this year.
A) Predicting B) Encouraging
C) Hoping D) Believing

304. Giving undue favour to one's own kith and kin
A) Bribery B) Corruption C) Nepotism D) Worldliness

Complete the conversation using the verbs in correct form

305. Ashok : Hello Navin! Where have you ________ since morning? The Boss is waiting for you.
A) Went B) Go C) Going D) gone

306. Navin: Is that so? I _______ to the passport office. I told him before I left.
A) went B) Go C) Going D) Gone

307. Ashok: He seems to have _______. These days is often forgetful.
A) forgets B) forgotten C) forgot D) forgetful

308. Ashok: Yes I ________. He is getting old.
A) agrees B) agreeing C) agreed D) agree

309. As the train was delayed, they could catch it ________ they were late.
A) until B) in C) inspite of D) although

310. Inform me in advance_________ you are unable to attend the meeting.
A) until B) although C) in case D) during

311. The Himalayan trekking team waited ________ the last trekker arrived at the base camp.
A) of B) inspite of C) although D) until

312. The captain of the hockey team broke his leg ________ the final match.
A) during B) on C) upon D) by

285)A, 286)B, 287)C, 288)D, 289)C, 290)A, 291)C, 292)C, 293)C, 294)B, 295)A, 296)C, 297)C, 298)B, 299)C, 300)C, 301)B, 302)D, 303)C, 304)C, 305)D, 306)A, 307)B, 308)D, 309)D, 310)C, 311)D, 312)A.

Choose correct Synonyms

313. Luminous

A) Easy B) Bright C) Cold D) Dull

314. Abridge

A) Strong B) Fortunate C) Shorten D) Sensible

315. Abundance

A) Plenty B) Sensitive C) Fast D) Complete

316. Regret

A) Repent B) Undesirable C) Reasonable D) Punctuation

317. Shrewd

A) Single B) Smart C) Synchronize D) Siren

318. Object

A) Tarnish B) Tamper C) Oppose D) Tropical

Choose the correct Antonyms

319. Impoverished

A) Wealthy B) Mean C) easy going D) Heat

320. Meager

A) Sick B) Scanty C) Abundant D) Paltry

321. Despair

A) Desolate B) Optimistic

C) Anguish D) Opportunistic

322. Augment

A) Empty B) Expand C) Diminish D) Inflate

323. Hinder

A) Hunter B) Hostage C) Help D) Hire

324. Contaminated

A) Dirty B) Tainted C) Pure D) Imperfect

325. Folly

A) Fully B) Forthright C) Foolish D) Wisdom

326. Look before you leap.

A) Climb a mountain and jump

B) to consider before you act

C) Look straight at people in their eyes

D) Do not stare at strangers.

327. In someone's shoes.

A) Pick up right shoes for the occasion

B) Run without shoes.

C) Buy your own shoes.

D) In someone else's place

328. Fight tooth and nail.

A) Fight against crime.

B) Women to use nails while fighting in self defence.

C) Fight or argue fiercely

D) Boxers Protect their teeth.

329. The top of the ladder.

A) Highest point of profession

B) Use wooden ladders for climbing.

C) Bring ladder to climb roof top.

D) Peak of a mountain.

330. Daylight robbery

A) Robbers at bank before sunrise

B) Solar eclipse

C) Very high prices of products.

D) Use of anti-glare glasses in sunlight.

PSI English - 4-3/5-3/2017

In Question 331 to 334, choose the correct meaning of the underlined proverb/idiom.

331. They meet each other <u>once in a blue moon.</u>

A) Frequently B) In the night

C) bery seldom D) In light of a blue moon

332. Ramesh was already having many problems and he did not want to <u>open a whole new can of worms.</u>

A) solve the problems B) insects to create problems

C) tackle a new problem D) enjoy solving his problems

333. Students were told to <u>pull up their socks</u> as the examinations were very close.

A) get the dress ready B) start studying hard

C) wear socks so that they do not fall ill

D) put all their books in place

334. Ameesh was tired of <u>playing the second fiddle</u> to his partner.

A) Being bullied B) Being overworked

C) Being treated as less important

D) Being always early to office

335 to 339 - Choose the option which is correctly spelt.

335. A) CEILING B) CIELING

C) CEELING D) CELIENG

336. A) OCASSION B) OCCASION

C) OCASION D) OCCASSION

337. A) EMBARASING B) EMBARASSING

C) EMBARRASSING D) EMBBARASING

338. A) SYPNOSIS B) SIPNOSIS

C) SYNOPSES D) SYNOPSIS

339. A) SAPARATE B) SAPERATE

C) SEPERATE D) SEPARTE

313)B, 314)C, 315)A, 316)A, 317)B, 318)C, 319)A, 320)C, 321)D, 322)C, 323)C, 324)C, 325)D, 326)B, 327)D, 328)C, 329)A, 330)C, 331)C, 332)C, 333)B, 334)C, 335)A, 336)B, 337)C, 338)D, 339)D.

340 to 344 - Fill in the blanks with the correct collective noun.

340. A ___________ of birds is always a beautiful sight.
A) Fleet B) Flight C) Group D) Range

341. Mahendra spotted a __________ of lions during his trip to Gujarat.
A) Army B) Swarm C) Collection D) Pride

342. A ________ of ants had formed around the sugar cube.
A) Army B) Colony C) Team D) Flock

343. A __________ of arrows was fired at the deer by the hunter.
A) Range B) Quiver C) Host D) Battalion

344. Children could spot a ________ of fish in the near by pond.
A) School B) Group C) Swarm D) Flock

345 to 351 - Choose the word which can be substituted for the given sentence / phrase.

345. A thing that is no longer in use.
A) Abandoned B) Obsolete C) Ancient D) Broken

346. A study of human societies and their cultures.
A) Psychology B) Economics
C) Anthropology D) History

347. Something that cannot be erased.
A) permanent B) indelible C) illegible D) incorrigible

348. A state in which a few govern the many.
A) Democracy B) Monarchy C) Oligarchy D) Anarchy

349. A person pretending to be someone he is not.
A) Magician B) Liar C) Thief D) Imposter

350. The absence of law and order in a society
A) Revolt B) Anarchy C) Mutiny D) Monarchy

351. Something which is very old.
A) Aged B) Redundant C) Ancient D) Obsolete

352 to 359 - Fill in the blanks with the correct preposition given in the options.

352. She wants to stay ________ home tonight.
A) in B) at C) inside D) to

353. I have not heard from him ________ last week.
A) for B) by C) since D) till

354. Ram must be back home ___________ 10 O'clock.
A) by B) till C) for D) to

355. I will arrive sometimes _______ eight and nine a.m.
A) on B) in C) next to D) between

356. I slept ______ the speech.
A) in B) during C) between D) ahead

357. The shop is _______ the road.
A) opposite B) above C) ahead D) across

358. He went and sat ______ him.
A) beside B) side C) in D) around

359. He went _______ the park on his bicycle.
A) up B) under C) around D) within

360 to 366 - From the given options, find out the correct antonym of the words.

360. Prevent
A) Help B) Obstruct C) Abbreviate D) Abandon

361. Abundant
A) Small B) Leave C) Scarce D) Widespread

362. Clumsy
A) Graceful B) Clean C) Appropriate D) Poor

363. Rapid
A) Extend B) Brief C) Fast D) Slow

364. Tame
A) Pet B) Forgive C) Wild D) Help

365. Merry
A) Divorce B) Sad C) Happy D) Forgetful

366. Blame
A) Praise B) Responsible C) Sugary D) Reprimand

367 to 372 - From the given options, choose the correct synonym.

367. Nomadic
A) Abundant B) Unsettled C) Permanent D) Happy

368. Stupid
A) Brilliant B) Dumb C) Fast D) Ignorant

369. Ample
A) Sufficient B) Scarce C) Orthodox D) Major

370. Predict
A) Foretell B) Explain C) Assert D) Observe

371. Concise
A) Strong B) Solid C) Long D) Brief

372. Conceal
A) Steal B) Avoid C) Hide D) Keep

373 to 390 Choose the correct option to fill in the blanks.

373. Let the flowers ________.
A) not plucked B) not be plucked
C) not be plucking D) not being plucked

374. When you phoned, I ___________ in the garden.
A) am working B) was working
C) will be working D) have been working

340)B, 341)D, 342)B, 343)B, 344)A, 345)B, 346)C, 347)B, 348)C, 349)D, 350)B, 351)C, 352)B, 353)C, 354)A, 355)D, 356)B, 357)D, 358)A, 359)C, 360)A, 361)C, 362)A, 363)D, 364)C, 365)B, 366)A, 367)B, 368)B, 369)A, 370)A, 371)D, 372)C, 373)B, 374)B.

375. I_________ my homework. What shall I do now?
A) did B) have done C) will do D) do

376. I think my ankle_____.
A) broken B) is broken C) has break D) break

377. She_________ all her childhood in France.
A) spend B) spends C) had spend D) has spent

378. What _________ at 4 O'clock yesterday evening?
A) were you doing B) are you doing
C) will you be doing D) did you doing

379. He went to the dentist _______ he had a toothache.
A) during B) which C) because D) on

380. Do you know the boy___ is standing next to Ramesh?
A) that B) he C) which D) who

381. The girl fell asleep_____ the movie.
A) in B) during C) between D) since

382. He is friendly and that is ________ I like him.
A) why B) what C) when D) who

383. She hates being interrupted ________ she is phoning.
A) because B) while C) since D) where

384. The accused ______ having made any statement.
A) rejected B) denied C) refused D) declined

385. If I________ you, I would have told him the truth.
A) am B) was C) were D) and

386. Mineral resource are _________ and difficult to find.
A) common B) scarce C) incomplete D) inconsistent

387. As_______ to private modes of transport, public transport is less polluting.
A) contrast B) compared C) segregate D) parallel

388. Plantation crops________ a large group of crops.
A) constitute B) contribute C) make D) declare

389. __________ to watch cricket everyday?
A) Do people in your country like
B) People in your country like
C) may people in your country like
D) Have people in your country like

390. It costs Rs.30 to have a tooth_________.
A) to fill B) fill C) filled D) have filled

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

391. ખાલી જગ્યા પૂરો.
_________ sugar is there in the bowl?
A) How many B) How much
C) How far D) એકેય નહીં

392. ખાલી જગ્યા પૂરો.
You _________ go home.
A) may B) can C) might D) એકેય નહીં

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

393. .... church on the corner was built by Britishers.
A) A B) An C) The D) Beside

394. Binny is .... M.B.A from Oxford University.
A) an B) a C) the D) at

395. I am agree .... your poinion.
A) with B) for C) to D) of

396. Rama is very excited .... our trip to Junagadh.
A) About B) For C) During D) Of

397. Synonym of Awful ....
A) dreadful B) happy C) curious D) thankful

398. Synonym of vacant ....
A) fulfil B) varient C) agree D) empty

399. Antonym of "Captive" ....
A) captain B) free C) leader D) capitalization

400. Antonym of "Shrink" ....
A) slave B) grow C) Shelter D) superior

401. .... Kishor go to temple daily?
A) Do B) Will C) Can D) Does

402. A group of boys .... library regularly.
A) are visiting B) is visiting C) visits D) visit

GSSSB મિકેનિક - 2017

403. I shall go.................... Fancy leads me.
A) why B) whither C) which D) what

404. .... the horse been mine, I would have shown it to the vaternary doctor.
A) Had B) Was C) were D) Have

405. Give adjective form of Enemy
A) enmity B) enimical C) inimical D) enimic

GSSSB સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017

406. I want to buy some good ________ for the office.
A) Stationory B) Stationery
C) Stationary D) Stationari

375)B, 376)B, 377)D, 378)A, 379)C, 380)D, 381)B, 382)A, 383)B, 384)B, 385)C, 386)B, 387)B, 388)A, 389)A, 390)C, 391)B, 392)A, 393)C, 394)A, 395)C, 396)A, 397)A, 398)D, 399)B, 400)B, 401)D, 402)C, 403)B, 404)A, 405)C, 406)B.

407. Join the pair using a proper conjunction.

I Speak the truth. I am not afraid of it.

A) I speak the truth to not afraid of it.

B) I speak the truth that I am not afraid of it

C) I speak the truth which I am not afraid of it

D) I am not afraid of it because I speak the truth.

408. નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.

1) Wound 2) Writer 3) Whiter 4) Worst

A) 1, 4, 3, 2 B) 2, 1, 3, 4 C) 3, 4, 1, 2 D) 3, 2, 1, 4

409. Translate the following sentences into English :

તમે કોઈ પણ કામ નિષ્ઠા વગર કરી નહીં શકો.

A) You can do no work without sincerity.

B) You can not work sincerely.

C) You could not do any work with sincerity.

D) No work can you work without sincerely.

410. _______ the horse been mine, I would have shown it to the vaterinary doctor.

A) Had B) Was C) Were D) Have

GSSSB સર્વેયર - 2016-17

411. .... is a word which expresses some sudden feelings.

A) A conjunction B) A preposition

C) A noun D) An interjection

412. My article.............by that time.

A) Has Written B) Will have written

C) will have been writing D) will have been written

413. I shall go.......Fancy Leads Me.

A) why B) Whither C) Which D) Wh

મુખ્ય સેવિકા - 8/1/2017

414. Will you allow her .... ?

A) sing B) sings C) is singing D) to sing

415. Which spelling is correct ?

A) equivalent B) iquivelen C) equivelent D) aquivelant

416. .... will it take to reach the project site ?

A) However B) How long C) How many D) How often

417. The doctor .... the patient to .... the stress.

A) ordered, avoid B) advised, avoid

C) says, avoid D) say, avoid

418. All know that .... is the man of ....

A) principle, principal B) the principal, principles

C) principals, principles D) a principal, a principle

419. India has now come through the .... of the recession.

A) good B) best C) bad D) worst

420. Ramesh and I .... neighbours.

A) am B) is C) be D) are

421. Mahesh is .... MD from ....US university.

A) an, a B) an, an C) a, a D) a, an

422. After .... while .... students left the hall.

A) A few, A little B) a little, a few

C) few, little D) many, more

423. .... union government rushed teams to ...... affected areas.

A) The, the B) An, an C) An, the D) A, an

424. .... they left Nepal when the tramors rocked the country.

A) Hardly had B) While

C) No sooner D) As soon as

425. The saint said,"The ____ hour is that before the dawn."

A) darks B) darkest C) bright D) brighten

426. "Shakuntalam" ....by Kadidasa.

A) was written B) written

C) wrote D) writes

427. No one .... he will do the next.

A) known, that B) knows, what

C) Knew, if D) know, why

428. She asked me .... I could read Marathi.

A) if B) unless C) till D) until

વિસ્તરણ અધિકારી - 7/1/2017

429. Listening is a skill of the language to.............

A) acquire B) accusation C) acquire D) requisition

430. We.................. on a vaccine for the last two years.

A) have been working B) working

C) work D) works

431. .... many cooks spoil the food.

A) To B) Two C) Too D) Through

432. As the army is here,there seems no .... danger.

A) immediate B) immediately

C) soon D) late

433. She .... that it was a very beautiful scene.

A) said to B) exclaim C) exclaimed D) ordered

407)D, 408)C, 409)A, 410)A, 411)D, 412)D, 413)B, 414)D, 415)A, 416)B, 417)B, 418)B, 419)D, 420)D, 421)A, 422)B, 423)A, 424)A, 425)B, 426)A, 427)B, 428)A, 429)A, 430)A, 431)C, 432)A, 433)C.

434. The saint said,"The virtue.............."
A) rewarded B) is rewarded C) rewarding D) reward

435. It is .... good practice to help .... poor and needy.
A) the, the B) a, the C) the, a D) a, a

436. Allow her ....more books.
A) buy B) buys C) bought D) to buy

437. .... will you meet if the boss is not available ?
A) Who B) Whom C) Whose D) Which

438. Do you know who .... the Ramayan ?
A) write B) writting C) written D) wrote

439. Do you have .... idea about his project ?
A) an B) and C) any D) few

440. He has worked hard, there is .... chance of failure.
A) few B) a few C) little D) any

441. The author, ... book is being released, is my friend.
A) who B) whom C) whose D) which

442. As soon as I sat under the tree, a branch ....
A) is falling B) fall C) fell D) fallen

443. .... do you visit the library in a week ?
A) How is B) How often C) How much D) How many

444. Have you............ visited Ayodhya ?
A) each B) every C) ever D) any

DPSSC જૂનિયર કલાર્ક - 19/02/2017

445. We saw children .... kites on their buildings.
A) flying B) flew C) were flown D) to fly

446. Stars.........not.......at daytime.
A) will, shine B) may, shine C) do, shine D) are, shined

447. Don't turn that way. It is ....one way street.
A) an B) the C) None D) a

448. Ravi didn't............play well ....take any wicket.
A) neither, nor B) so, that
C) both, and D) either, or

449. It is desirable to take ....in any business if you want to make profit.
A) risk B) loan C) recourse D) advise

450. The boy ....you punished was weeping a lot.
A) who B) whose C) why D) whom

451. ....dogs seldom bite.
A) Barking B) Bark
C) Having barked D) Barked

452. Return means ....
A) Profit B) settle C) exchange D) reject

453. Raju tries to behave..........his father has taught him.
A) as if B) both C) as D) like

454. Find out correct spelling.
A) Delivary B) Dilivery C) Dellivery D) Delivery

455. What is opposite of 'vast' ?
A) gigantic B) enormous C) magnified D) small

આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

456. Put question tag :
Everyone stood up,............ ?
A) don't they ? B) doesn't he ?
C) didn't they ? D) aren't they ?

457. Give a single word for :
'A person who pretends to be better than he is.'
A) Smart B) traitor C) Clever D) Hypocrite

458. Arrange the following words in 'Alphabetical order'.
(1) Fear (2) Feign (3) Feeling (4) Feeble
A) 1, 4, 3, 2 B) 2, 3, 4, 1 C) 4, 3, 2, 1 D) 3, 2, 1, 4

459. Give plural form of : 'mouse'
A) Mouses B) mice C) Mousis D) mices

460. Covert in to indirect speech :
He said "Honesty is the best policy"
A) He said that honesty is the best policy
B) He said that honesty was the best policy
C) He said honesty had been the best policy
D) He asked me if honesty is the best policy

461. Give the first verb form of : bereaved
A) bereave B) bear C) barefoot D) beareve

462. Fill in the gap.
Fossils : creatures :: mummies : ....
A) Egypt B) Human beings
C) Animals D) Martyrs

463. Give Synonym : To inquire
A) respond B) consort C) interrogate D) wipe out

464. Give plural form of : 'ratio'
A) ratios B) ratioes C) raties D) rateos

465. Put proper 'wh' pronoun in the following sentence :
.... I went there, the door was locked.
A) Where B) How C) When D) Why

466. Put proper 'wh' pronoun in the following sentence :
This is the fine opportinity .... should not be lost.
A) what B) which C) where D) when

434)B, 435)B, 436)D, 437)B, 438)D, 439)C, 440)C, 441)C, 442)C, 443)B, 444)C, 445)A, 446)C, 447)D, 448)D, 449)A, 450)D, 451)A, 452)C, 453)C, 454)D, 455)D, 456)C, 457)D, 458)A, 459)B, 460)A, 461)A, 462)B, 463)C, 464)A, 465)C, 466)B.

467. Change the Gender : stag

A) Hind B) Stagi C) Stagnant D) hynd

468. Use proper conjunction :

Hemant tiptoed into the room .... he should disturb the class.

A) lest B) and C) so that D) therefore

469. Change the voice : Do not laugh at a beggar

A) Let a beggar not be laughed at.

B) A beggar is not at laughed.

C) You don't have to laugh at a beggar.

D) A beggar was not laughted at.

470. Find the correct spelling of the word for 'Generations'

A) Contemporaries B) Contemprories

C) Contamporaries D) Contempraries

471. .... the match, the students were happy. (Have + win)

A) Have won B) Having won

C) Having win D) Had won

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

472. Find out the correct sentence.

A) Take care lest you should not fall

B) Take care lest you fall

C) Take care lest you do not fall

D) Take care lest you should feit

A) B B) D C) A D) C and A

473. Give opposite gender for : Earl

A) Countess B) Early C) Shabi D) Emperor

474. He was............Nepoleon of his age.

A) a B) the C) an D) none

475. Give the Plural form of : Ratio

A) Ratios B) Ratioes C) Ratina D) Rateas

476. Change the degree

A foolish friend is worse than a wise enemy

A) A foolish friend is as bad as a wise enemy

B) A wise enemy is not so bad as a foolish friend.

C) A wise enemy is as bad as a foolish friend.

D) A foolish friend is not so bad as a wise enemy

477. Usually we ....our car............at Rahim's Garage. (Have+service)

A) Had....Service B) have.....serviced

C) Has......serviced D) have......served

478. Select Single word for the following phrase.

Government based on religion

A) Diarchy B) Theocracy C) Plutocracy D) Aristocracy

479. Use appropriate verb form

The sun............in the west.

A) Sats B) Rises C) dose not set D) does not rise

GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017

480. Use appropriate verb form :

The patient ....if the doctor had come on time.

A) could have been saved B) would have saved

C) was saved D) will be saved

481. Give Past tense of 'seek'

A) seeked B) sook C) shake D) sought

482. The ....you work hard, the.............result you get. (much, good)

A) more........better B) more.......best

C) less........batter D) More.......batter

483. They............the rebels in the market place.

A) Hunged B) hanged C) hangs D) none

484. Give opposite gender for : 'Monk'

A) Nun B) Prist C) Friar D) monky

485. ....sickness, she appeared at the examination.

A) Instead of B) Inspite of C) Due to D) Because of

486. Find out the correct sentence

A) You Will be suspended if you pay your fees.

B) You will be suspended unless you dont pay your fess.

C) You will be suspended if you had paid your fess.

D) You will be suspended unless you pay your fees.

A) C B) A C) D D) B

487. Plural form of 'Brother' (members of a society or community)

A) Brotherse B) Brethren C) Brotheres D) Bretheren

488. Fill in the gap.

Current : Circuit : : Earth : ....

A) Planet B) solar System C) Orbit D) Path

489. They..........the silver lamps from the ceiling.

A) hangs B) hanged C) hung D) hunged

490. Opposite gender of 'Abbot'

A) Abbotress B) Abbotess C) Abbess D) Abbotee

467)A, 468)A, 469)A, 470)A, 471)B, 472)A, 473)A, 474)B, 475)A, 476)B, 477)B, 478)B, 479)D, 480)A, 481)D, 482)A, 483)B, 484)A, 485)B, 486)C, 487)B, 488)C, 489)C, 490)C.

491. Make assertive sentence :
What an interesting story this is !
A) An interesting Story this is
B) This is interesting Story.
C) This story is interesting.
D) This is a very interesting story

492. I am a fast bowler, __________ ?
A) amn't I ? B) ain't I ? C) are I ? D) do I ?

493. Give the Noun form of :
To weave
A) woof B) web C) A and B D) weafe

494. Fill in the blanks : ________ more __________ merrier.
A) The, a B) A , A C) A, the D) The, the

495. Convert into indirect speech : He said : " Honesty is the best policy."
A) He said that honesty is the best policy.
B) He said that honesty was the best policy.
C) He said honesty had been the best policy.
D) He asked me if honesty is the best policy.

496. Take care _________ you fall.
A) lest B) so that C) and D) though

497. Find Similar sentence : Seeing the jeep of police, the thief ran away.
A) Had the thief seen the jeep of police, he ran away
B) Having seen the jeep of police, the thief ran away
C) If the thief had seen the jeep of Police. the thief run away
D) the thief saw the jeep of Police Becaise he ran away

498. Select single word for the following phrase :
'Person who eats human flesh'
A) Veteran B) Cantabile
C) Cannibal D) Trencherman

499. Give Past form of 'To bereave'
A) bearceved B) bereft C) bereved D) bareaved

500. In the olden days, People believed that the earth was............
A) Stationory B) Stationari C) Stationery D) Stationary

501. Give verb form of 'Poor'
A) to poverty B) to poorish
C) to poorise D) to impoverish

502. Make exclamatory sentence of :
It was really a memorable match.
A) What a match it was memorable !
B) How memorable match was it !
C) What a memorable match was it !
D) What a memorable match it was !

503. Find out correct spelling :
A) Lieutenant B) Leiutenant
C) Lieutenent D) Leftenant

504. Change into passive voice :
Thay asked me my name.
A) My name is asked by them.
B) I asked my name by them.
C) I was asked my name by them
D) I am asked my name by them.

505. _________ the dinner not __________ yet ?
A) Was ___ prepared B) Have ___ been prepared
C) Has ___ been prepared D) Will ___ we prepared

506. ....do you think, will get the first Prize ?
A) Who B) Whom C) Whose D) How

507. Put proper Question tag :
Everyone stood up, ...?
A) didn't they B) did he
C) wasn't he D) were they

508. ....sincere are always rewarded.
A) An B) A C) The D) Not required

509. અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે નીચેનામાંથી કયો શબ્દ ચોથા ક્રમે આવશે ?
A) False B) Follow C) Faithfully D) Fool

510. We went early ....to get a good seat.
A) owing B) so as C) but D) due

491)D, 492)B, 493)C, 494)D, 495)A, 496)A, 497)B, 498)C, 499)B, 500)D, 501)D, 502)D, 503)A, 504)C, 505)C, 506)A, 507)A, 508)C, 509)D, 510)B.

ગણિત અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017

1. **એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો.**
A) 4236 B) 4306 C) 4336 D) 5336
શેષ = 46
ભાજક = 5 x શેષ = 5 x 46 = 230, ભાજક = ભાગફળ x 10
ભાગફળ = 230/10 = 23
ભાજ્ય = ભાજક x ભાગફળ + શેષ
= 230 x 23 + શેષ
= 5290 + 46
= 5336

2. **એક સંખ્યાના $\frac{3}{5}$ ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.**
A) 80 B) 100 C) 75 D) 90
સંખ્યા = X લેતાં,
$x \times \frac{3}{5} \times 60\% = 36$ $x \times \frac{3}{5} \times \frac{60}{100} = 36$
$x = \frac{36 \times 5 \times 10}{3 \times 6}$ $x = 100$

3. **ABCDમાં (A → Z = 26 →1)મુજબ જોતા Y + Z = X, W + X = T અને W+Z = V હોય તો T + U=.......**
A) D B) N C) Q D) P
ABCDમાં જમણી બાજુથી ડાબી બાજુ જતાં, Z - પ્રથમ અને A - 26માં સ્થાને આવે. તે પ્રમાણે જોતા,
Y + Z = X W + X = T
↓ ↓ ↓ ↓ ↓ ↓
2 + 1 = 3 4 + 3 = 7

W + Z = V
↓ ↓ ↓
4 + 1 = 5, તો T + U = ?
↓ ↓ ↓
7 + 6 = 13
↓
N
ABCDમાં જમણી બાજુથી ડાબી બાજુ જતાં, 13મા સ્થાને 'N' આવે, તો જવાબ B) N રહેશે.

5. **જો GKARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય ?**
A) 183952 B) 189352 C) 189532 D) 198532
આપેલ શબ્દ GKAREને સાંકેતિક ભાષામાં → 6 7 8 1 0 દ્વારા દર્શાવવામાં આવે છે, જેમાં મૂળાક્ષર G → 6ને ઉદ્દેશે છે, K → 7ને, A → 8ને R → 1ને અને E → 0ને ઉદ્દેશે છે.
તે પ્રમાણે આપેલ બીજા,
MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે છે જેમાં દરેક અંગ્રેજી મૂળાક્ષર, તેની સામે આપેલ નંબરને ઉદ્દેશે છે. (M → 2ને, O → 3ને, N → 9ને, S → 5ને, O → 3ને, O → 3ને, N → 9ને).
જેથી RANSOM શબ્દના દરેક મૂળાક્ષરને, ઉપર આપેલ મૂળાક્ષરના કોડ પ્રમાણે ઉદ્દેશવામાં આવશે.
R A N S O M
↓ ↓ ↓ ↓ ↓ ↓
1 8 9 5 3 2
તો જવાબ C) 189532 રહેશે.

6. **છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?**
A) 4 B) 10 C) 15 D) 16
છ ઘંટનો એક સાથે વાગવાનો સમય
= 2, 4, 6, 8, 10, 12નો લ.સા.અ. = 120 Sec = 2 મિનિટ
એટલે કે, દર 2 મિનિટે એકસાથે વાગશે.
30 મિનિટમાં એકસાથે વાગવાની ઘટના,
$= \frac{30 \text{ મિનિટ}}{2 \text{ મિનિટ}} = 15$ વખત
પરંતુ, અહીં શરૂઆતમાં છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થયાનું કહેલું આથી, સાચો જવાબ = 15+1 = 16 વખત

7. **3 વર્ષ પહેલા પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતા કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય ?**
A) 1 વર્ષ B) 1.5 વર્ષ C) 2 વર્ષ D) 3 વર્ષ
3 વર્ષ પહેલાં 5 સભ્યોની ઉંમરનો સરવાળો
= 17 x 5 = 85 વર્ષ
આથી, આ 5 સભ્યોની હાલની ઉંમરનો સરવાળો
= 85 + 15 = 100 વર્ષ
(દરેક સભ્યની ઉંમર 3 વર્ષ વધે, તો 3 વર્ષ x 5 સભ્ય = 15 વર્ષ)
બાળકની સાથે કુટુંબના સભ્યોની ઉંમરનો સરવાળો = 17 x 6
= 102 વર્ષ
આથી, બાળકની ઉંમર = 102 - 100 = 2 વર્ષ

8. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પુરો.

KM 5, IP 8, GS 11, EV 14, ...

A) BX 17 B) BY 17 C) CY 17 D) CY 18

+3 +3 +3 +3

-2 -2 -2 -2

KM 5 IP 8 GS 11 EV 14 CY 17

+3 +3 +3 +3

આ પ્રમાણે જવાબ C) CY 17 આવે.

9. ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.

A) 40 B) 48 C) 60 D) 72

પહેલી સંખ્યા = X, બીજી સંખ્યા = Y, ત્રીજી સંખ્યા = Z

X : Y Y : Z

2 : 3 5 : 3

x_5 x_5 x_3 x_3

લ.સા.અ. = 15

X : Y : Z

10 : 15 : 9

બીજી સંખ્યા, Y= 15/34

બીજી સંખ્યા $y = \frac{15}{34} \times 136 = 60$

10. દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતાં બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો.

A) 19 વર્ષ B) 29 વર્ષ C) 39 વર્ષ D) 49 વર્ષ

Aની હાલની ઉંમર = X વર્ષ

Bની હાલની ઉંમર = Y વર્ષ

$\therefore$ X - Y = 9 વર્ષ કહી શકાય.

$\therefore$ X = Y + 9

Aની ઉંમર 10 વર્ષ બાદ,

Bની 10 વર્ષ પહેલાની ઉંમરથી બમણી હોય.

$\therefore X + 10 = 2 (Y - 10)$ $\therefore X + 10 = 2Y - 20$

$\therefore Y + 9 + 10 = 2Y - 20$ $\therefore 2Y - Y = 19 + 20$

$\therefore$ Y = 39 વર્ષ

11. એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતા તેણે જવાબ આપ્યો, 'મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાની ઉંમરના ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે.' તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?

A) 18 વર્ષ B) 20 વર્ષ C) 24 વર્ષ D) 32 વર્ષ

વ્યક્તિની હાલની ઉંમર = X વર્ષ

$3 (X + 3) - 3(X - 3) = X$

$3X + 9 - 3X + 9 = X$ 18 વર્ષ = X

આમ, વ્યક્તિની હાલની ઉંમર = 18 વર્ષ

12. A, Bના 150% છે. B એ (A+B)નો કેટલા ટકા થાય ?

A) $33\frac{1}{3}\%$ B) 40 % C) $66\frac{2}{3}\%$ D) 75 %

જો A, Bના 150% હોય, તો

B = 100

A = 150

A + B = 250

B એ (A+B)ના ટકા $= \frac{B}{A+B} \times 100$


$= \frac{100}{250} \times 100$

$= 40\%$

13. 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળુ દૂધ મળે ?

A) 5 લિટર B) 7 લિટર C) 10 લિટર D) 15 લિટર

100% શુદ્ધ દૂધમાં 0% પાણી ગણાય.



14. 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ?

A) 22 B) 14 C) 13 D) 11

$\frac{M_1 D_1}{W_1} = \frac{M_2 D_2}{W_2}$

$\frac{18 \times 10}{900} = \frac{M_2 \times 12}{660}$

$M_2 = \frac{18 \times 66}{12 \times 9}$

$M_2 = 11$ કામદાર

M_1 = 18 કામદાર

D_1 = 10 દિવસ

W_1 = 900 પુસ્તક

W_2 = 660 પુસ્તક

D_2 = 12 દિવસ

M_2 = ?

15. એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલા મીટર હશે ?

A) 500 B) 600 C) 750 D) 900

ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ = X મી.

90 kmph = 25 m/s

ઝડપ $= \frac{\text{અંતર}}{\text{સમય}}$

25 મી/સે. $= \frac{\text{ટ્રેન + પ્લેટફોર્મની લંબાઈ}}{\text{60 સેકન્ડ (1 મિનિટ)}}$


25 × 60 = X + X

1500 = 2X

X = 750 મી.

16. નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે?

A) 10 મીટર B) 24 મીટર C) 28 મીટર D) 38 મીટર



આ પ્રમાણે જવાબ B) 24 મીટર આવે.

17. 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?

A) 5% B) 15 % C) 9 % D) 7 %

ધારો કે,

- મૂ.કિ. = 100 ₹

19% નફાથી વેચતાં,

- વે. કિ. = 119 ₹

40% વધુ છાપેલી કિંમત,

- છાપેલ કિંમત = 140 ₹
- વળતર = 140 ₹ - 119 ₹ = 21 ₹

% વળતર $= \frac{21 ₹}{140 ₹} \times 100$

= 15%

18. 143ના અવયવોની સરાસરી શોધો.

A) 43 B) 47 C) 42 D) 37

143ના અવયવ,

= 1, 11, 13, 143

143 અવયવોની સરેરાશ,

$= \frac{1 + 11 + 13 + 143}{4} = \frac{168}{4} = 42$

19. અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD.....Zમાં ડાબી બાજુના છેડેથી 18મા અને જમણી બાજુના છેડેથી 10મા મૂળાક્ષરની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે ?

A) P B) S

C) આપેલ વિકલ્પોમાંથી કોઈ નહી D) કોઈ મૂળાક્ષર નહી

અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD.....Zમાં ડાબી બાજુના છેડેથી 18મા સ્થાને 'R' આવે અને જમણી બાજુના છેડેથી 10મા સ્થાને 'Q' આવે.

તે પ્રમાણે Q અને R મૂળાક્ષરની બરાબર મધ્યમાં કોઈ મૂળાક્ષર નહીં આવે.

20. ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સે.મી. છે. તેને પીગાળીને તેમાંથી 1 સે.મી. વ્યાસવાળી..........ગોળીઓ બનાવી શકાય.

A) 2000 B) 8000 C) 6000 D) 5000

ગોળાઓની સંખ્યા $= \frac{\text{મોટા ગોળાનું ઘનફળ}}{\text{1 નાની ગોળીની ઘનફળ}}$

$= \frac{\frac{4}{3}\pi r_1^3}{\frac{4}{3}\pi r_2^3}$

$= \frac{10\times10\times10}{\frac{1}{2}\times\frac{1}{2}\times\frac{1}{2}}$

$= 8000$

21. સાદુરૂપ આપો.

$9\frac{3}{4} + 7\frac{2}{12} - 9\frac{1}{15} = ...$

A) $12\frac{17}{20}$ B) $7\frac{17}{20}$ C) $8\frac{17}{20}$ D) $11\frac{17}{20}$

પૂર્ણાંક સંખ્યા અલગત કરતાં,

9 + 7 - 9 = 7

હવે, અપૂર્ણાંક સંખ્યા માટે

$\frac{3}{4} + \frac{2}{12} - \frac{1}{15} = \frac{45+10-4}{60} = \frac{51}{60} = \frac{17}{20}$

આથી, $= 7 + \frac{17}{20} = 7\frac{17}{20}$

રેવન્યૂ તલાટી - 28/02/2016

22. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે?

A) 25 B) 20 C) $16\frac{2}{3}$ D) 12.5

ચોખા, ઘઉં કરતાં ટકાવારીમાં મોંઘા,

$= \frac{R}{100-R} \times 100 \quad = \frac{20}{100-20} \times 100$


$= \frac{20}{80} \times 100 \quad = \frac{1}{4} \times 100 \quad = 25\%$

23. 10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

A) 11326 રૂા. B) 11236 રૂા. C) 11623 રૂા. D) 11263 રૂા.

વ્યાજ દર છ મહિને ગણવા માટે,

અહીં વ્યાજદર = 12% / 2 = 6%



ચક્રવૃદ્ધિ વ્યાજ = 600 + 600 + 36 = 1236 ₹

નવી રાશિ = 10,000 ₹ + 1236 ₹ = 11,236 ₹

24. લીપ-વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના............છે ?

A) 0 B) $\frac{1}{2}$ C) $\frac{1}{7}$ D) $\frac{2}{7}$

લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય છે.

જેમાં '52' અઠવાડિયા અને '2' વધારાના દિવસ હોય છે. વધારાના '2' દિવસ, (રવિવાર, સોમવાર), (સોમવાર, મંગળવાર), (મંગળવાર, બુધવાર), (બુધવાર, ગુરુવાર), (ગુરુવાર, શુક્રવાર), (શુક્રવાર, શનિવાર), (શનિવાર, રવિવાર) હોય શકે છે.

જેના આધારે, લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના 2/7 હોય છે.

25. એક વેપારીએ રૂપિયા 4,000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ?

A) 20% B) 30% C) 40% D) 45%

ધારો કે, 100 ₹ નો માલ ખરીદ્યો,

એકંદરે 25% નફો = 25 ₹

અડધો માલ (50 ₹) પર 10% મળ્યો,

$= 50 \times \frac{10}{100} = 5$ ₹

બાકી માલ પર જરૂરી મેળવવાનો નફો,

= 25 ₹ - 5 ₹ = **20 ₹**

બાકી માલ પર નફાની ટકાવારી (50 ₹) = $\frac{20 ₹}{50 ₹} \times 100$

= 40%

26. પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી..........થાય.

A) 3.6 B) 7.8 C) 3.4 D) 5.6

- પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ,

$= \frac{2+3+5+7+11}{5} = \frac{28}{5} = 5.6$

27. $\frac{3}{7}, \frac{5}{9}, \frac{7}{11}, \frac{4}{7}, \frac{4}{9}, \frac{4}{11}$, ની સરાસરી શોધો.

A) $\frac{1}{2}$ B) $\frac{345}{693}$ C) $\frac{347}{693}$ D) $\frac{3}{4}$

સરેરાશ $= \frac{\text{અવલોકનનો સરવાળો}}{\text{અવલોકનની સંખ્યા}}$

$= \frac{\frac{3}{7}+\frac{4}{7}+\frac{5}{9}+\frac{4}{9}+\frac{7}{11}+\frac{4}{11}}{6}$

$= \frac{\frac{3+4}{7}+\frac{5+4}{9}+\frac{7+4}{11}}{6}$

$= \frac{\frac{7}{7}+\frac{9}{9}+\frac{11}{11}}{6}$

$= \frac{1+1+1}{6} = \frac{3}{6} = \frac{1}{2}$

28. જો ABCDમાં A - 26, SUN=27 હોય તો CAT = ...

A) 24 B) 27 C) 57 D) 58

ABCDમાં જમણી બાજુથી ડાબી બાજુ જતાં, Z પ્રથમ અને A = 26માં સ્થાને આવે

જેના આધારે S = 8માં સ્થાને

U = 6મા સ્થાને

N = 13મા સ્થાને આવે,

(8 + 6 + 13) = 27, તો આપેલ પ્રશ્ન પ્રમાણે,

C A T

↓ ↓ ↓

24 + 26 + 7 = 57 થાય.

29. વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને ?

A) 66 B) 132 C) 96 D) 144

12 બિંદુમાંથી 2 બિંદુ જોડવાથી એક જીવા બની શકે.

- અહીં, સંચયનો નિયમનો ઉપયોગ કરતાં,

$^{12}C_2 = \frac{12\times11}{2} = 66$

30. એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો Aને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ?

A) 30 B) 32 C) 36 D) 72

A : Bની કાર્યદક્ષતા = 2 : 1

	1દિવસ	
A	= 2 યુનિટ	
B	= 1યુનિટ	72યુનિટ (24×3યુનિટ)
A+B	= 3યુનિટ	

A એકલાને લાગતો સમય,

= 72 યુનિટ / 2 યુનિટ = **36 દિવસ**

31. બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે.બન્ને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

A) 12 સેકન્ડ B) 15 સેકન્ડ C) 16 સેકન્ડ D) 1 મીનીટ

બન્ને ટ્રેનોને પસાર થવાનો સમય $= \frac{\text{ટ્રેનોની લંબાઈ}}{\text{સાપેક્ષ ઝડપ}}$

$= \frac{185\text{મી.} + 215\text{મી.}}{(50+40)\text{કિ.મી./ક.}}$

$= \frac{400\text{મી.}}{25\text{મી/સે.}}$

= 16સેકન્ડ

32. જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય ?

A) 36568 B) 63568 C) 63569 D) 65368

આપેલ 'NOIDA' શબ્દના દરેક મૂળાક્ષર તેની સામે આપેલ નંબરને ઉદ્દેશે છે.

(N→3, O→9, I→6, D→5, A→8)

જે પ્રમાણે,

I N D I A

↓ ↓ ↓ ↓ ↓

6 3 5 6 8 રહેશે.

જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ

33. કઈ સંખ્યા મોટી છે ?

A) 3.006 B) 3.0006 C) 3.6 D) 3.06

3.6 > 3.06 > 3.006 > 3.0006

34. અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ?

A) 624407 B) 624405 C) 624408 D) 624409

પ્રથમ નોટ → 624328

\+ 79 (કેમ કે એક નોટ ગણેલી છે)

624407

35. 0.5 ÷ 0.125 =..............

A) 0.625 B) 6.25 C) 4 D) 16

$$=\frac{0.5}{0.125}=\frac{5\times1000}{10\times125}=\frac{500}{125}=4$$

36. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે. તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ?

A) 36, 16 વર્ષ B) 40, 20 વર્ષ C) 25, 5 વર્ષ D) 30, 10 વર્ષ

પિતા = X, પુત્ર = Y

X - Y = 20

X + Y = 40

2X = 60

X = 30

Y = 40 - X = 40 - 30 Y = 10

શોર્ટ કટ : આ પ્રશ્ન વિકલ્પથી પણ આસાનીથી કરી શકાય.

37. જો + એટલે ÷, - એટલે X, ÷ એટલે + અને X એટલે - હોય તો 10-2÷4 X 10 + 5 =................

A) 22 B) 18 C) 24 D) 32

= 10 - 2 ÷ 4 × 10 + 5

+→÷, -→×, ÷→+, ×→- લેતાં,

= 10 × 2 + 4 - 10 ÷ 5 = 10 × 2 + 4 - 2

= 20 + 4 - 2 = 24 - 2

= 22

38. કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંક 4 હોય તો તેના ઘનમૂળના એકમનો અંક.......... હોય.

A) 6 B) 8 C) 2 D) 4

$4^3 = 64$ થાય,

આમ સંખ્યા 64ના ઘનમૂળનો એકમ અંક 4 બનશે.

39. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

A) 3 B) 0 C) 1 D) 2

2 સૌથી નાની અવિભાજ્ય છે.

જેમની પાસે માત્ર અવયવ છે.

2 અને 1 અથવા તે સ્વયં અને 1.

40. 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ?

A) 75% B) 12.5 % C) 25 % D) 50 %

52 પાનામાંથી 13 ચોકટના પત્તા હોય છે.

'ચોકટ'નું પત્તુ હોવાની સંભાવના $=\frac{13}{52}=\frac{1}{4}$

સંભાવનાની ટકાવારી $=\frac{1}{4}\times100=25\%$

41. $1^{100}+100^0$ બરોબર કેટલા ?

A) 1 B) 2 C) 200 D) 101

$= 1^{100}+100^0$

= 1 + 1 (કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત 1 થાય) = 2

42. $\sqrt{16\times256}=(.......)^2$

A) 16 B) 8 C) 7 D) 9

$\sqrt{16\times256}=(x)^2$ $4\times16=x^2$

$64=x^2$ $\sqrt{64}=x$

$x=8$

43. સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ?

A) 6% B) 16% C) 24% D) 12%

ટકાવારીની ગણતરી 100માંથી કરવામાં આવે છે.

આથી, રૂપિયાની કિંમતમાં ફેરફાર થાય, તો પણ 6% નફો સરખો જ રહેશે.

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

44. કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદુ વ્યાજ રૂ.4320 થાય છે તો તે રકમ ....રૂપિયા હશે.

A) 2700 B) 8200 C) 6000 D) 7200

સાદુંવ્યાજ $=\frac{P\times R\times N}{100}$ $4320=\frac{P\times12\times5}{100}$

$P=\frac{4320\times100}{12\times5}$ = ₹ 7200

45. 150-80/5+14 =..................

A) 28 B) 184 C) 148 D) 90

$150 - \frac{80}{5} + 14$

ભા.ગુ.સ.બા.ના નિયમ મુજબ,

150 - 16 + 14 = 150 - 2 = 148

46. ગાણિતિક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા .... છે.


A) 1 B) 0 C) 1/2 D) એકપણ નહીં

યાદ રાખો, સરવાળા માટે તટસ્થ સંખ્યા = 0

ગુણાકાર માટે તટસ્થ સંખ્યા = 1

47. વર્તુળની મોટામાં મોટી જીવાને ....કહે છે.

A) ત્રિજ્યા B) પરિઘ C) ક્ષેત્રફળ D) વ્યાસ



અહીં AB એ વ્યાસ છે જે વર્તુળની મોટામાં મોટી જીવા ગણાશે.

48. 2.197નું ઘનમૂળ:.............છે.

A) 1.3 B) 13 C) 0.13 D) 0.013

$$\sqrt[3]{2.197} = \sqrt[3]{\frac{2197}{1000}} = \frac{13}{10} = 1.3$$

49. 0.02 x 0.3 x 1.3 = ...

A) 7.8 B) 0.078 C) 0.0078 D) 7,800

$$\frac{2}{100}\times\frac{3}{10}\times\frac{13}{10} = \frac{78}{10000} = 0.0078$$

50. $(a-b)^2$ = ...

A) a^2-b^2 B) $a^2+2ab+b^2$

C) a^2+b^2 D) $a^2-2ab+b^2$

યાદ રાખો, $(a-b)^2 = a^2 - 2ab + b^2$

$(a+b)^2 = a^2 + 2ab + b^2$

51. $(0.6)^4$ = ...

A) 12.96 B) 1.296 C) 0.1296 D) 129.6

$$(0.6)^4 = \left(\frac{6}{10}\right)^4 = \frac{(6^2)^2}{10^4} = \frac{36^2}{10^4} = \frac{1296}{10000} = 0.1296$$

52. એક માણસે બીજા માણસને કહ્યું 'તમારા ભાઈનો પુત્ર, એ મારો પુત્રનો સગો ભાઈ થાય' તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

A) પિતા-પુત્ર B) સસરો-જમાઈ

C) સાળો-બનેવી D) ભાઈ-ભાઈ

'તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય' મતલબ એક માણસ બે દિકરા અને બંને દિકરા, બીજા માણસના ભત્રીજા થાય.

જેથી કહી શકાય કે એક માણસ બીજા માણસનો ભાઈ છે.

જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ

53. જો A = {a, b, c, d} હો તો ગણ Aના ઉપગણોની સંખ્યા કેટલી થાય ?

A) 4 B) 8 C) 12 D) 16

ગણ Aના ઉપગણોની સંખ્યા = n^2

અહીં n = a, b, c, d એમ 4 થશે.

તેથી, ઉપગણોની સંખ્યા = $n^2 = 4^2 = 16$

54. એક સમબાજુ ત્રિકોણની બાજુનુ માપ $10\sqrt{2}$ છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ?

A) $20\sqrt{3}$ B) $20\sqrt{2}$ C) $50\sqrt{2}$ D) $50\sqrt{3}$

સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ = $\frac{\sqrt{3}}{4}\times a^2$

અહીં $a = 10\sqrt{2}$ ક્ષે. $= \frac{\sqrt{3}}{4}\times(10\sqrt{2})^2 = \frac{\sqrt{3}}{4}\times100\times2 = 50\sqrt{3}$

55. એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે તેના પર 15% વળતર મળે છે તો પુસ્તક ખરીદવા કેટલાં રૂપિયા ચૂકવવા પડે ?

A) 690 B) 510 C) 609 D) 591

છાપેલી કિંમત = 600 રૂ.

વળતર (%) = 15%

વળતર (રૂ.) = 600 × 15/100 = 90 રૂ.

ખરીદવા માટેની કિંમત = 600 - 90 = 510 રૂ.

56. લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ?

A) 1/7 B) 2/7 C) 3/7 D) 4/7

લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય છે.

જેમાં '52' અઠવાડિયા અને '2' વધારાના દિવસ હોય છે.

વધારાના '2' દિવસ,

(રવિવાર, સોમવાર), (સોમવાર, મંગળવાર), (મંગળવાર, બુધવાર), (બુધવાર, ગુરુવાર), (ગુરુવાર, શુક્રવાર), (શુક્રવાર, શનિવાર), (શનિવાર, રવિવાર) હોય શકે છે.

જેના આધારે, લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના 2/7 હોય છે.

GPSC પેપર - 1 - 2017

57. ભેંસો અને બતકોના એક સમૂહમાં કુલ પગની સંખ્યા કુલ માથાની સંખ્યા કરતાં 24 જેટલી વધારે છે, તો તે સમૂહમાં ભેંસો કેટલી હશે ?

A) 17 B) 18

C) 19 D) વિગતો અપૂરતી છે

ભેંસો = X, બતક = Y

પગની સંખ્યા		માથાની સંખ્યા
4X + 2Y	=	X + Y + 24

4X - X + 2Y - Y = 24

3X + Y = 24

અહીં આગળ પ્રશ્નનું કોઈ સોલ્યુશન નથી.

કેમ કે, વિગતો અપૂરતી છે.

58. એક સાંકેતિક લિપીમાં 'FRIEND' ને 'KTJMUH' તરીકે લખવામાં આવે છે. તો 'CANDLE' ને કઈ રીતે લખવામાં આવશે ?

A)HDOMSI <u>B)HCOLSI</u> C)HCOJSJ D)HBQLSI

આપેલ શબ્દનો સાંકેતિક લિપી સાથે નીચે પ્રમાણે સંબંધ છે.

+5 +2 +1 +8 +7 +4

F R I E N D

↓ ↓ ↓ ↓ ↓ ↓

K T J M U H

આજ સંબંધનો ઉપયોગ કરતાં,

+5 +2 +1 +8 +7 +4

C A N D L E

↓ ↓ ↓ ↓ ↓ ↓

H C O L S I

59. એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે. તે 69 કિમી / કલાકની ઝડપે ગતિ કરે છે, તો તે ટ્રેનની જ દિશામાં 9 કિમી / કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતાં ટ્રેનને કેટલો સમય લાગશે ?

A)9 સેકન્ડ B) 10 સેકન્ડ C) 11 સેકન્ડ <u>D) 12 સેકન્ડ</u>

$$\text{સમય} = \frac{\text{અંતર}}{\text{ઝડપ}} = \frac{\text{ટ્રેનની લંબાઈ}}{\text{સાપેક્ષ ઝડપ}}$$

$$= \frac{200\text{મી.}}{60\times\frac{5}{18}\text{મી/સે.}} = \frac{200}{\frac{5}{3}} = 12 \text{ સેકન્ડ}$$

60. ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે; જ્યારે ગામ Yની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બન્ને ગામોની વસ્તી એકસરખી હશે?

A) 16 B) 12 C) 14 <u>D) એકપણ નહીં</u>

X ગામની વસતી = 78000

Y ગામની વસતી = <u>52000</u>

વસતીનો તફાવત = 26000

X ગામની વસતી 1200 પ્રતિ વર્ષ ઘટે અને

Y ગામની વસતી 800 પ્રતિ વર્ષ વધે તો

1 વર્ષમાં વસતીનો ફેરફાર = 1200 + 800 = 2000

2000નો તફાવત → 1 વર્ષ $= \frac{26000\times1}{2000} = 13$ વર્ષ

26000નો તફાવત → ?

61. જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.

A) 7 B) -7 C) 2 <u>D) -2</u>

$3X + Y = 19$ 1

$X + 3Y = 1$ 2

સમી 2ને 3 વડે ગુણી Xની કિંમત સરખી કરતાં,

$3X + Y = 19$

$3X + 9Y = 3$

$- \quad - \quad -$

$-8Y = 16$

$Y = -\frac{16}{8} = -2$

સૂચના : નિર્ણય કરો કે આપેલા પ્રશ્નો (પ્રશ્ન નં.62 અને 63)ના જવાબ આપવા માટે તેમની નીચે આપેલા વિધાનો I અને II પર્યાપ્ત છે કે નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

62. લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ કેટલું થશે ?

વિધાન I : લંબચોરસની પહોળાઈ 18 સેમી છે.

વિધાન II : લંબચોરસની લંબાઈ 20 સેમીથી વધારે નથી.

A) માત્ર વિધાન I પર્યાપ્ત છે.

B) માત્ર વિધાન II પર્યાપ્ત છે.

C) વિધાન I અને II એક સાથે પર્યાપ્ત છે, પરંતુ કોઈપણ વિધાન એકલું પર્યાપ્ત નથી.

<u>D) વિધાન I અને II એકસાથે પણ પર્યાપ્ત નથી.</u>

- લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવા માટે લંબાઈ X પહોળાઈ મેળવવી પડે છે.
- અહીં પહોળાઈ 18 સે.મી. આપી છે પરંતુ લંબાઈ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.
- આથી, બન્ને વિધાને સાથે લંબાઈ તો પણ પર્યાપ્ત નથી.

63. એક વર્ગમાં તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે ?

વિધાન I : વર્ગમાં 45 છોકરાઓ અને 30 છોકરીઓ છે.

વિધાન II : છોકરાઓનું સરેરાજ વજન 60 અને છોકરીઓનું સરેરાશ વજન 50 છે.

A) માત્ર વિધાન I પર્યાપ્ત છે.

B) માત્ર વિધાન II પર્યાપ્ત છે.

<u>C) વિધાન I અને II એક સાથે પર્યાપ્ત છે, પરંતુ કોઈપણ વિધાન એકલું પર્યાપ્ત નથી.</u>

D) વિધાન I અને II એકસાથે પણ પર્યાપ્ત નથી.

તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન

$$= \frac{\text{છોકરાઓ + છોકરાઓનું કુલ વજન}}{\text{કુલ વિદ્યાર્થીની સંખ્યા}}$$

વિધાન I પરથી વિદ્યાર્થીઓની સંખ્યા મેળવી શકાય.

વિધાન II પરથી સરેરાશ વજન × સંખ્યા કરી તેમના વજનનો સરવાળો મળી શકે.

આથી વિધાન I અને II એક સાથે પર્યાપ્ત છે, પરંતુ એકલું વિધાન પર્યાપ્ત નથી.

સૂચના : નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી પ્રશ્ન નં.64 થી 66ના જવાબ આપો.

જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ- એમ સાત રંગોના ધ્વજ એક હારમાં ડાબેથી જમણે ગોઠવવામાં આવે છે (આ ધ્વજ દર્શાવેલા ક્રમમાં હોય તે જરૂરી નથી). નીલા રંગના અને પીળા રંગના ધ્વજ વચ્ચે ચાર ધ્વજ છે. નીલા વાદળી ધ્વજની અને પીળા ધ્વજની વચ્ચે નારંગી ધ્વજ નથી. જાંબલી ધ્વજ અને લાલ ધ્વજ તરત બાજુમાં આવી શકશે નહીં.

64. આપેલ માહિતી પરથી ધ્વજની કુલ કેટલી ગોઠવણીઓ શક્ય થશે ?

A) 5 B) 8

C) 13 <u>D) ઉપરના પૈકી કોઈ નહીં</u>

આપેલ માહિતીને આધારે ધ્વજની કુલ 16 ગોઠવણીઓ શક્ય થશે.

65. જો સાત ધ્વજ ઉપરાંત કાળો અને સફેદ ધ્વજ એવી રીતે ઉમેરવામાં આવે કે તેઓ બન્ને એકબીજાની બાજુ-બાજુમાં હોય પરંતુ બન્નેમાંથી એક પણ જાંબલી ધ્વજ કે લાલ ધ્વજની બાજુમાં ન હોય, તેમજ બન્નેમાંથી એક પણ કોઈપણ છેડા પર ન હોય તો જુદા જુદા કેટલા પ્રકારે આ ગોઠવણી શક્ય બનશે ?

A)24 B)48

C)96 D)<u>ઉપરના પૈકી કોઈ નહીં</u>

ઉપરોક્ત પ્રશ્ન પ્રમાણે કાળો અને સફેદ ધ્વજની ગોઠવણીમાં પણ તે મુજબ શક્યતાઓ રહેશે.

66. નીચે પૈકી કયુ વિધાન ચોક્કસપણે સત્ય છે ?

A)પીળો ધ્વજ કોઈપણ એક છેડા પર છે.

B)નીલો ધ્વજ અને નારંગી ધ્વજ એકબીજાની બાજુ-બાજુમાં છે.

C)<u>વાદળી ધ્વજ લીલા ધ્વજની બાજુમાં છે.</u>

D)ઉપરના પૈકી કોઈ નહીં

આપેલ માહિતીને આધારે, જો નીલા રંગ અને પીળા રંગના ધ્વજ વચ્ચે ચાર ધ્વજ હોય અને લીલા અને પીળા ધ્વજની વચ્ચે નારંગી ધ્વજ ના હોય. ઉપરાંત વાદળી ધ્વજની તરત બાજુમાં જાંબલી ધ્વજ અને લાલ ધ્વજ આવી શકે નહી, તો વાદળી ધ્વજ લીલા ધ્વજની બાજુમાં જ આવે.

આપેલ માહિતી પરથી ધ્વજની કુલ ઘણી ગોઠવણીઓ શક્ય છે, જેમાંની એક નીચે પ્રમાણે છે.

<u>નારંગી</u> <u>નીલા</u> <u>વાદળી</u> <u>લીલા</u> <u>જાંબલી</u> <u>લાલ</u> <u>પીળો</u>

જવાબ : C) વાદળી ધ્વજ લીલા ધ્વજની બાજુમાં છે.

67. A અને B બે ખામીયુક્ત ઘડિયાળો છે. દર કલાકે A 10 મિનીટ મોડી પડે છે અને B 10 મિનીટ આગળ નીકળે છે. એક દિવસે બપોરે 12:00 વાગે બન્ને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે તો એ જ દિવસે જો B સાંજના 7:00 કલાક બતાવતી હોય તો A કયો સમય બતાવતી હશે ?

A)સાંજના 4:30 B)<u>સાંજના 5:00</u>

C)સાંજના 5:30 D)સાંજના 6:00

B 10 મિનિટ આગળ નીકળે છે. તો તે 6 કલાકમાં 60 મિનિટ આગળ નીકળે. એટલે કે સાચા સમય પ્રમાણે 6:00 વાગ્યા હોય ત્યારે B 7:00 કલાક બતાવશે.

હવે જ્યારે 'A' દર કલાકે 10 મિનિટ મોડી પડે છે, તો તે 6 કલાકે 60 મિનિટ મોડી પડે. એટલે કે સાચા સમય પ્રમાણે 6:00 વાગ્યા હોય ત્યારે ઘડિયાળ A, 5:00 વાગ્યાનો સમય બતાવશે.

68. $(15.01)^2 \times \sqrt{730}$ ની આશરે કિંમત કેટલી થશે ?

A)6125 B)<u>6075</u> C)6025 D)5975

$= (15.01)^2 \times \sqrt{730}$

$= 15^2 \times \sqrt{729}$ (આશરે કિંમત)

$= 225 \times 27$

$= 6075$

69. એક લંબચોરસની લંબાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20% જેટલો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 192 ચો.સેમી થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે ?

A)180 ચો.સેમી. B)190 ચો.સેમી.

C)<u>200 ચો.સેમી.</u> D)ઉપરના પૈકી કોઈ નહીં

લંબાઈ = X પહોળાઈ = Y

$X \times \frac{120}{100} \times Y \times \frac{80}{100} = 192$

$X \times \frac{6}{5} \times Y \times \frac{4}{5} = 192$

$XY = \frac{192 \times 5 \times 5}{6 \times 4} = \frac{32 \times 5 \times 5}{4}$

$= 8 \times 5 \times 5 = 200$ સેમી^{2}

∴ મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ,

XY = 200 ચો.સેમી

70. નીચેની શ્રેણીમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે ?

1, 2, 9, 44, 267, 1854, ...

A)2 B)9 C)44 D)<u>267</u>

71. A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂ.3,240 કમાઈ શકે છે. A અને C સાથે 10 દિવસમાં રૂ.1,200, જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂ.1,820 કમાઈ શકે છે. તો B ની રોજિંદી કમાણી કેટલી હશે ?

A)70 રૂ. B)<u>60 રૂ.</u> C)80 રૂ. D)50 રૂ.

A + B + C ની 1 દિવસ કમાણી $= \frac{3240}{18} = 180$ રૂ.

A + C ની 1 દિવસ કમાણી $= \frac{1200}{10} = 120$ રૂ.

Bની રોજીંદી કમાણી = (A+B+C) - (A+C)

= 180 - 120 = 60 રૂ.

72. એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ?

A)51 B)52 C)<u>53</u> D)50

એક લિપ વર્ષમાં કુલ 366 દિવસ હોય છે. જેમાં 52 અઠવાડિયા + 2 દિવસ વધુ હોય છે.

હવે, જો લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર હોય તો તે વર્ષનો છેલ્લો દિવસ સોમવાર હોય.

જેથી, તે વર્ષમાં કુલ 53 સોમવાર હશે.

73. જો a ના 20% b હોય તો 20 ના b% કેટલા થશે ?

A)a ના 2% B)<u>a ના 4%</u> C)a ના 20% D)a ના 25%

ધારો કે, a = 100 b = 20

તેથી 20ના b% = 20×20/100 = 4

અહીં વિકલ્પ Bની કિંમત a ના 4% = 100×4/100 = 4 થશે જે સરખી થાય છે.

74. જો રમેશ 7 કિમી / કલાકની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે. પણ જો તે 8 કિમી / કલાકની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. શાળા કેટલી દૂર હશે ?

A) 14 કિમી B) 21 કિમી C) 16 કિમી D) 28 કિમી

9 મિનિટ મોડા અને 6 મિનિટ વહેલા એટલે બન્ને સમયનો તફાવત 15 મિનિટ થાય.

સમય-1 - સમય-2 = 15 મિનિટ

અંતર-1 / ઝડપ-1 - અંતર-2 / ઝડપ-2 = 15/60 કલાક

અંતર બન્નેમાં સરખું છે જેને X લેતાં,

$\frac{X}{7} - \frac{X}{8} = \frac{1}{4}$ કલાક

$\frac{8X - 7X}{56} = \frac{1}{4}$

X = 56/4 = 14 કિ.મી.

75. નીચેની વિગતોનો અભ્યાસ કરી આપેલ પ્રશ્નનો જવાબ આપો.

A+B એટલે A એ Bની માતા છે

A-B એટલે A અને Bની બહેન છે

AxB એટલે A અને Bના પિતા છે

A ≠ B એટલે A અને Bની દીકરી છે


A=B એટલે A અને Bનો ભાઈ છે

નીચેના પૈકી કયો વિકલ્પ ''P એ Q ની માસી'' સૂચવે છે.

A) P - R + Q B) P ≠ R x Q

C) P + R x Q D) P x R = Q

પ્રથમ વિકલ્પની મદદથી નીચે પ્રમાણે આકૃતિ બનશે.



આકૃતિની મદદથી P નો Q સાથેનો 'માસી'નો સંબંધ જોવા મળે છે.

જવાબ : A) P-R+Q

કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017)

76. 100 મીટર લંબાઈની 72 કીમી/કલાક ની ઝડપે જતી એક ટ્રેન ને તે જ દિશામાં જતી 200 મીટર લંબાઈની અને 63 કીમી/કલાક ની ઝડપે જતી બીજી ટ્રેન ને પસાર કરવા કેટલો સમય લાગશે?

A) 150 સેકન્ડ B) 140 સેકન્ડ C) 100 સેકન્ડ D) 120 સેકન્ડ

સમય $= \frac{\text{અંતર}}{\text{ઝડપ}} = \frac{\text{બન્ને ટ્રેનોની લંબાઈનો સરવાળો}}{\text{સાપેક્ષ ઝડપ}}$

$= \frac{100\text{ મી} + 200\text{ મી}}{(72-63)\text{ કિ/ક}} = \frac{300\text{ મી}}{(72-63)\text{ કિ/ક}}$

$= \frac{300\text{ મી}}{9 \times \frac{5}{18}\text{ મી/સે}} = 120$ સેકન્ડ

77. ત્રિકોણના વેધ અને પાયા બંન્ને ને 40% જેટલો વધારવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં થતો % વધારો શોધો.

A) 40 % B) 80 % C) 96 % D) 140 %

ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 × પાયો × વેધ

વેધ = X = +40%

પાયો = Y = +40%

% ક્ષેત્રફળમાં વધારો $= X + Y + \frac{XY}{100}$

$= 40 + 40 + \frac{40 \times 40}{100}$

$= 80 + 16 = +96\%$

'+'નું ચિહ્ન વધારો સૂચવે છે.

આમ, ક્ષેત્રફળમાં 96% વધારો થશે.

78. જો $\frac{1}{a} + \frac{1}{b} = \frac{1}{c}$ અને ab = c, a અને bની સરેરાશ કેટલી થશે?

A) 0 B) 1 C) $\frac{1}{2}$ D) $\frac{1}{4}$

$\frac{a+b}{ab} = \frac{1}{c}$ $a+b = \frac{ab}{c}$

$a+b = \frac{c}{c}$ (કેમકે, ab = c) $a+b = 1$

a અને bની સરેરાશ $= \frac{a+b}{2} = \frac{1}{2}$

79. એક ગોળાકાર દડાનો વ્યાસ 21 સેમી છે, આ દડાને પીગાળી તેમાંથી 1 સેમી બાજુના સમઘન બનાવવામાં આવે છે. તો આ રીતે મેળવેલ સમઘનની સંખ્યા કેટલી હશે?

A) 5000 B) 4800 C) 4853 D) 4851

સમઘનની સંખ્યા $= \frac{\text{ગોળાનું ઘનફળ}}{\text{1 સેમીના સમઘનનું ઘનફળ}}$

$= \frac{\frac{4}{3}\pi r^3}{a^3}$

$= \frac{\frac{4}{3} \times \frac{22}{7} \times \frac{21}{2} \times \frac{21}{2} \times \frac{21}{2}}{1 \times 1 \times 1} = 4851$

80. એક સંખ્યા 95555(?)4353 નો ખૂટતો (?) અંક શોધો કે જેથી તે સંખ્યા 11 વડે વિભાજ્ય થાય.

A) 1 B) 5 C) 7 D) 3

9 5 5 5 5 X 4 3 5 3

એકી સ્થાનના અંકનો સરવાળો

= 9 + 5 + 5 + 4 + 5 = 28

બેકી સ્થાનના અંકનો સરવાળો

= 5 + 5 + X + 3 + 3 = 16 + X

એકી અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાવો જોઈએ.

28 - 16 - X = 11 12 - 11 = X X = 1

81. એક પ્રાણી સંગ્રહાલયમાં સસલાં અને કબૂતરો છે. જો તેમનાં માથાંની સંખ્યા ગણવામાં આવે તો તે 190 છે, તથા તેમના પગની સંખ્યા ગણવામાં આવે તો તે 560 છે. તો કબૂતરો કેટલા હશે?

A) 100 B) 108 C) 110 D) 112

કબૂતરોની સંખ્યા ગણવા માટે,
માંથાની સંખ્યાને 4 ગણી કરી, તેની તફાવત પગની સંખ્યા વડે લઈ, તેને 2 વડે ભાગવાથી મળી શકશે.

190 માંથા
↓ × 4
760 200/2 = 100 કબૂતર હશે.
- 560 (કેમ કે, જેટલા કબૂતર હશે તેટલા દરેક
200 દીઠ 2 પગની સંખ્યા ઓછી હશે.)

82. A એક સાઈકલ ચોક્કસ કિંમતે ખરીદે છે, પછી તે 40% નફા સાથે B ને વેચે છે. પછી B તે C ને વેચે છે અને 40% ખોટ ખાય છે. જો C અને રૂ.4200 તેના માટે ચૂકવ્યા હોય, A તો એ તે સાઈકલ કેટલી કિંમતે ખરીદી હશે?

A) રૂ.4000 B) રૂ.5000 C) રૂ.7000 D) રૂ.9000

ધારો કે,

A
↓ 100 × 40% નફો → + 40 ₹ નફો
B
↓ 140 × 40% ખોટ → - 56 ₹ ખોટ
C = 140-56 = 84 ₹

Cની કિંમત	Aની કિંમત	
84 ₹	100	$=\frac{4200\times100}{84}$
4200 ₹	?	= 5000₹

83. એક બે અંકની સંખ્યાના અંકોની અદલા બદલી કરી એક નવી સંખ્યા બનાવવામાં આવે છે તો તે બે સંખ્યાઓનો તફાવત કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે?

A) 11 B) 5 C) 9 D) 13

કોઈ બે અંકની સંખ્યાની ધારણા કરી જવાબ મળી શકે.
ઉદાહરણ,
57 → 75
18 9 વડે ભાગી શકાય.

84. એક રકમ પર બીજા અને ત્રીજા વર્ષે મળેલ ચક્રવૃધ્ધિ વ્યાજ અનુક્રમે રૂ.1200 ને રૂ.1440 હોય તો વ્યાજનો દર શોધો.

A) 18% પ્રતિ વર્ષ B) 25% પ્રતિ વર્ષ
C) 20% પ્રતિ વર્ષ D) 24% પ્રતિ વર્ષ

બીજા વર્ષે → 1200 ₹
↓ + 240 ₹ વ્યાજ
ત્રીજા વર્ષે → 1440 ₹
આમ, 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 240 ₹ થાય.

વ્યાજદર $=\frac{240}{1200}\times100 = 20\%$

85. 222 ના 22 %ના 2% નીચે પૈકી કયા થશે?

A) 0.9768 B) 0.2442 C) 48.84 D) 09898

$222\times\frac{22}{100}\times\frac{2}{100}=\frac{9768}{10000}=0.9768$

86. 255 નો મોટામાં મોટો અવયવ કયો હશે?

A) 85 B) 17 C) 51 D) 5

255ના અવયવ,
= 255, 85, 51, 17, 15, 5, 3, 1
આથી, ઉપરોક્ત વિકલ્પમાંથી મોટામાં મોટો અવયવ 85 છે.

87. પાંચ સતત આવતી અયુગ્મ (odd numbers) સંખ્યાઓ ની સરેરાશ 61 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ હશે?

A) 65 B) 36 C) 630 D) 67

પાંચ ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 61 છે.

__ __ 61 __ __

59 61 63
-2 +2

57 59 61 63 65
-4 +4

88. એક સાંકેતિક ભાષામાં ROBUST ને QNATRS તરીકે લખવામાં આવે, તો કયા શબ્દને ZXCMP તરીકે લખવામાં આવશે?

A) AWDLQ B) AYDNQ C) AYBNO D) YYBNO

-1	-1	-1	-1	-1	-1	
R	O	B	U	S	T	→ આપેલ શબ્દ
↓	↓	↓	↓	↓	↓	↓
Q	N	A	T	R	S	→ સાંકેતિક ભાષા

એટલે કે આપેલ અંગ્રેજી શબ્દના દરેક મૂળાક્ષરને સામે આપેલ સાંકેતિક ભાષામાં લખાયેલ કોડ સાથે સીધો સંબંધ છે અને જે (-1)નો છે. તો પ્રશ્નમાં અંગ્રેજી શબ્દ શોધવાનો છે.

શબ્દ	: A	Y	D	N	Q
	↑	↑	↑	↑	↑
આપેલ સાંકેતિક ભાષા	: Z	X	C	M	P
	+1	+1	+1	+1	+1

89. એક હારમાં, રાધા ડાબેથી સાતમે તથા સીતા જમણેથી ચોથે સ્થાને છે. જો રાધા અને સીતા એકબીજાના સ્થાન બદલે તો રાધા ડાબેથી પંદરમાં સ્થાને આવશે. તો સીતાનું નવું સ્થાન જમણેથી કયું હશે?

A) બારમું B) પંદરમું C) છઠ્ઠું D) ચોથું

→ 7th R ... S 4th ←
→ 7th S → 15th ... (?) ← R 4th ←

સીધી હરોળની કુલ સંખ્યા
= [15 + (4-1)] = 18
સીતાનું જમણેથી નવું સ્થાન
= 18 - 7 = 11 + 1 = 12

90. **QIOK : MMKO : : ZBPC: ?**

A) VFLK __B) VFLG__ C) WFLG D) VGLG

-4 +4 -4 +4

Q I O K

↓ ↓ ↓ ↓

M M K O

આપેલ મૂળાક્ષરને સામે આપેલ મૂળાક્ષર સાથે સીધો સંબંધ છે. જેના આધારે,

-4 +4 -4 +4

Z B P C

↓ ↓ ↓ ↓

V F L G

91. **જો "tee see mee" એટલે "Drink Fruit Juice","see kee lee" એટલે "Juice Is Sweet" અને "lee ree nee" એટલે "He Is Intelligent" હોય, તો તે ભાષામાં "Sweet" માટે કયો શબ્દ હશે?**

A) see B) lee __C) kee__ D) mee

tee __see__ mee - Drink Fruit __Juice__

__see__ kee [lee] - __Juice__ [is] sweet

[lee] ree nee - He [is] Intelligent

આપેલ ત્રણ વાક્યની મદદથી કહી શકાય કે,


see એટલે Juice,

lee એટલે is,

kee એટલે sweet.

92. **એક માણસ એક બિંદુએથી પૂર્વ તરફ 90 મીટર ચાલે છે, પછી તે પોતાની જમણી તરફ વળી 20 મીટર ચાલે છે. ફરીથી તે પોતાની પોતાની જમણી તરફ વળી 30 મીટર ચાલ છે. અંતે તે, પોતાની જમણી તરફ વળી 100 મીટર ચાલે છે. હવે તે શરૂઆતના બિંદુથી કેટલે દૂર આવ્યો હશે?**

A) 80 મીટર __B) 100 મીટર__ C) 120 મીટર D) 200 મીટર



$AC^2 = AB^2 + BC^2$


$= (80)^2 + (60)^2$

$= 6400 + 3600$

$AC^2 = 10000$

$AC = 100$

નિર્દેશ : (પ્રશ્નો 93 થી 97 માટે) નીચેના પ્રશ્નોમાં ત્રણ વર્ગ આપવામાં આવ્યા છે. નિર્ણય કરો કે નીચે આપેલ આકૃતિઓ પૈકી કયા વિકલ્પમાંથી આકૃતિ આપેલ ત્રણ વર્ગ વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે વ્યકત કરે છે?



93. **માતાઓ, સ્ત્રીઓ, પરિચિત લોકો**

A) A B) B C) C __D) D__

માતાઓ, સ્રીઓ અને પરિચિત લોકો વચ્ચેનો સાચો સંબંધ નીચે મુજબ છે.



94. **ચા, કોફી, પીણાં**

A) A B) B __C) C__ D) D

ચા, કોફી અને પીણાં વચ્ચેનો સાચો સંબંધ નીચે મુજબ છે.



95. **રમતવીરો, છોકરાઓ, વિજેતાઓ**

__A) A__ B) B C) C D) D


રમતવીરો, છોકરાઓ અને વિજેતાઓ વચ્ચેનો સાચો સંબંધ નીચે મુજબ છે.



96. **પક્ષીઓ, ચકલીઓ, ઉંદરો**

A) A __B) B__ C) C D) D


પક્ષીઓ, ચકલીઓ અને ઉંદરો વચ્ચેનો સાચો સંબંધ નીચે મુજબ છે.



97. **ઉંચા માણસો, કાળા વાળ ધરાવતા માણસો, ભારતીયો**

__A) A__ B) B C) C D) D

ઉંચા માણસો, કાળા વાળ ધરાવતા માણસો અને ભારતીયો વચ્ચેનો સાચો સંબંધ નીચે મુજબ છે.



(પ્રશ્ન નં : 98 થી 102) એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલા અને પાસ થયેલા જુદા જુદા રાજ્યોના આપેલા વર્ષોના ઉમેદવારોની સંખ્યા

વર્ષ	1997		1998		1999		2000		2001	
રાજ્ય	ઉપ.	પાસ	ઉપ.	પાસ	ઉપ.	પાસ	ઉપ.	પાસ	ઉપ.	પાસ
P	6400	780	8800	1020	7800	890	8750	1010	9750	1250
Q	8100	950	9500	1240	8700	980	9700	1200	8950	995
R	7800	870	7600	940	9800	1350	7600	945	7990	885
M	5200	720	8500	980	7400	850	6800	775	9500	1125
N	7500	840	9200	1050	8450	920	9200	980	8800	1020

98. રાજ્ય N માં, તમામ વર્ષોમાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો સાપેક્ષ તમામ વર્ષોમાં પાસ થયેલ ઉમેદવારોની ટકાવારી કેટલી છે?

A) 10.11% B) 10.75% C) 12.36% D) 11.14%

N રાજ્યમાં,

ઉપસ્થિત રહેલ ઉમેદવારોની સંખ્યા,

= 7500 + 9200 + 8450 + 9200 + 8800 = 43150

પાસ ઉમેદવારોની સંખ્યા,

= 840 + 1050 + 920 + 980 + 1020 = 4810

ટકાવારી = 4810/43150×100 = 11.14%

99. આપેલ વર્ષોમાં P રાજયમાંથી ઉપસ્થિત રહેલ ઉમેદવારોની સરેરાશ કેટલી થશે?

A) 8300 B) 8920 C) 8990 D) 8410

P રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલ ઉમેદવારોની સરેરાશ

= સરવાળો/સંખ્યા

= 6400 + 8800 + 7800 + 8750 + 9750/5

= 41500/5 = 8300

100. વર્ષ 1998 માં P અને Q રાજ્યોમાં સંયુક્ત રીતે, પાસ થયેલ ઉમેદવારોની ઉપસ્થિત રહેલ ઉમેદવારો સાપેક્ષ ટકાવારી કેટલી થશે?

A) 10.87% B) 11.87% C) 12.35% D) 13.35%

1998માં, P અને Q રાજ્યોમાં,

ઉપસ્થિત ઉમેદવારો = 8800 + 9500 = 18300

પાસ ઉમેદવારો = 1200 + 1240 = 2260

ટકાવારી = 2260/18300×100 = 12.35%

101. વર્ષ 1997માં બધા રાજ્યોના કુલ પાસ થયેલા ઉમેદવારો, વર્ષ 1998માં બધા રાજ્યોના કુલ પાસ થયેલા ઉમેદવારોના આશરે કેટલા ટકા છે ?

A) 72.5% B) 77.5% C) 79.5% D) 83.5%

102. બધા રાજ્યો પૈકી વર્ષ 1999માં ક્યા રાજ્યમાં પાસ થયેલા ઉમેદવારોની ઉપસ્થિત રહેલ ઉમેદવારો સાપેક્ષ ટકાવારી મહત્તમ છે.

A) M B) R C) P D) Q

103. P, Q, R, S અને T પાંચ વક્તાઓને એક ચોક્કસ દિવસે બોલવાનું છે. તેઓનો બોલવાનો ક્રમ આપેલ ક્રમ મુજબ હોય તે જરૂરી નથી, R એ પહેલો કે છેલ્લો વકતા વક્તા નથી. S ના વકતવ્ય બાદ ત્રણ વકતાઓ બાકી રહે છે અને T ના વક્તવ્ય પહેલા ત્રણ વકતાઓ વકતવ્ય આપી ચુકયા છે. જો P નું વકતવ્ય Q ના વકતવ્ય પછીથી હોય તો છેલ્લો વકતા કોણ હશે?

A) S B) P C) T D) Q

દિવસ

1-Q, 2-S, 3-R, 4-T, 5-P

જવાબ : B

105. 441 : 361 : : 729 : (?)

A) 684 B) 625 C) 676 D) 741

441 : 361 729 : 625

$(21)^2$: $(19)^2$ $(27)^2$: $(25)^2$

104. જો સંખ્યા "298490721" ના અંકોને ઉતરતાં ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અંકો તેના મૂળ સ્થાને રહેશે?

A) 2 B) 3 C) 4 D) 6

સંખ્યાના અંકોને ઉતરતાં ક્રમમાં ગોઠવતાં,

સંખ્યા = 2 9 8 4 9 0 7 2 1

ઉતરતો ક્રમ = 9 9 8 7 4 2 2 1 0

105. એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી એવા દરેક મૂળાક્ષર માટે, જેની સ્થાન કિંમત (place value) અવિભાજય સંખ્યા હોય તેને 1 કોડ આપવામાં આવે તથા બાકીના મૂળાક્ષરોને 2 કોડ આપવામાં આવે તો "EXAMINA-TION" શબ્દનો કોડ શો થશે?

A) 12212222222 B) 12112212222

C) 21121122222 D) 12222212222

5 24 1 13 9 14 1 20 9 15 14

E X A M I N A T I O N

1 2 2 1 2 2 2 2 2 2 2

દરેક મૂળાક્ષરની સ્થાન કિંમત લખતાં, અવિભાજય સંખ્યા શોધી શકાય છે. જેના આધારે કોડ ઉપર પ્રમાણે રહેશે.

કોમર્શિયલ ટેક્સ ઇન્સપેક્ટર - પેપર-2 (28/5/2017)

106. $\sqrt{676} \div ? \times 57 = 114$

A) 13 B) 15 C) 26 D) 21

$\sqrt{676} \div x \times 57 = 114$ $\frac{26}{x} \times 57 = 114$

$x = \frac{26 \times 57}{114}$ $x = \frac{26}{2}$, $x = 13$

107. એક બસ ત્રણ કલાકમાં 150 કિમીનું અંતર કાપે છે અને આગળના બે કલાકમાં પ્રતિ કલાક 60 કિમીની ઝડપે મુસાફરી કરે છે. બસની પ્રતિ કલાકની સરેરાશ ઝડપ કેટલી છે ?

A) 60 કિમી/પ્રતિ કલાક B) 54 કિમી/પ્રતિ કલાક

C) 72 કિમી/પ્રતિ કલાક D) 52 કિમી/પ્રતિ કલાક

બસ દ્વારા 2 કલાકમાં 60 કિ.મી./ક.ની ઝડપે કપાયેલું અંતર,

= ઝડપ × સમય

= 60 × 2 કલાક

= 120 કિ.મી.

સરેરાશ ઝડપ $= \frac{\text{કુલ અંતર}}{\text{કુલ સમય}} = \frac{150\text{કિ.મી.} + 120\text{કિ.મી.}}{3\text{ક} + 2\text{ક}}$

$= \frac{270\text{કિ.મી.}}{5\text{ક}} = 54\text{કિ.મી./કલાક}$

108. દુષ્કાળ રાહત ભંડોળમાં વિદ્યાર્થીઓએ કુલ રૂપિયા 17,424ની રકમનો ફાળો આપ્યો. દરેક વિદ્યાર્થીએ જેટલી સંખ્યામાં છોકરાઓ હતા તેટલી રકમનો ફાળો આપ્યો તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે ?

A)102 B)122 C)112 D)132

ધારો કે, વિદ્યાર્થીની સંખ્યા = X

દરેક વિદ્યાર્થીની રકમ = X ₹

$x \times x = 17424$ $x^2 = 17424$

$x = \sqrt{17424}$ $= 132$

109. જો +ને ÷, ÷ ને x અને x ને + તરીકે ગણવામાં આવે તો 64 + 8 x 32 ÷ 4 = ...

A)136 B)144 C)160 D)128

64 + 8 × 32 ÷ 4 (+ ને ÷, ÷ ને × અને × ને + તરીકે ગણતાં)

= 64 ÷ 8 + 32 × 4 = 8 + 32 × 4 = 8 + 128 = 136

110. DAUGHTER શબ્દને બારાક્ષરી ક્રમમાં (Alphabetical Order)માં ગોઠવવામાં આવે તો તેમાના કેટલા અક્ષરો બદલ્યા સિવાય યથાવત રહે છે ?

A)એક B)બે C)ત્રણ D)એકપણ નહીં

શબ્દ : D A U G H T E R

Alphabetical Order : A D E G H R T U

શબ્દના દરેક મૂળાક્ષરને Alphabetical Orderમાં ગોઠવવામાં આવે તો બે મૂળાક્ષર એવા મળશે કે જેમની જગ્યા બદલાશે નહીં.

111. એક વર્ગખંડમાં 25 છોકરાઓનું સરેરાશ વજન 48 કિલોગ્રામ છે. 40 વિદ્યાર્થીઓના વર્ગખંડમાં સરેરાશ વજન 45 કિલોગ્રામ છે તો આ વર્ગખંડમાં 15 છોકરીઓનું સરેરાશ વજન કેટલું થાય?

A)40 કિગ્રા B)36 કિગ્રા C)38 કિગ્રા D)42 કિગ્રા

સંખ્યા	×	સરેરાશ	= સરવાળો
40	×	45 kg	= 1800 kg
25	×	48 kg	= 1200 kg
15	×	? kg	= 600 kg (તફાવત)

15 છોકરીઓનું સરેરાશ વજન 600 kg/15 = 40 kg

112. A, B, C વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે છે કે Aને મળેલ દર એક રૂપિયાની સામે B પાસે 65 પૈસા અને C પાસે 40 પૈસા મળે. જો C ભાગે રૂ.8 આવેલ હોય તો કુલ નફાની રકમ કેટલી હોય ?

A)રૂ.41 B)રૂ.46 C)રૂ.40 D)રૂ.35

A : B : C

100 પૈસા : 65 પૈસા : 40 પૈસા

કુલ નફો = 100 પૈસા + 65 પૈસા + 40 પૈસા

= 205 પૈસા

કુલ નફો

C ને 40 પૈસા ⟶ 205 પૈસા

C ને 8 ₹ ⟶ ?

$= \frac{8 \times 205}{40} = 41$ ₹

113. $\sqrt{45.5625}$ = ...

A)5.35 B)5.45 C)6.35 D)6.75

$\sqrt{45.5626} = \sqrt{\frac{455626}{10000}} = \frac{675}{100} = 6.75$

114. રૂ.2500નું 6%ના દરે તા.5 જાન્યુઆરીથી 31 મે, 1999 સુધીનું વ્યાજ કેટલું થાય ?

A)રૂ.60 B)રૂ.72 C)રૂ.76 D)રૂ.80

5 જાન્યુઆરી થી 31 મે ના દિવસોની સંખ્યા = 146 દિવસ

સાદું વ્યાજ $= \frac{P \times R \times N}{100}$

$= \frac{2500 \times 6 \times 146}{100 \times 365} = \frac{25 \times 6 \times 2}{5} = 60$ રૂ.

115. $(3.6 \times 10^3) \div (9 \times 10^{-2})$ = ...

A)4×10^5 B)4×10^4 C)40 D)4×10^{-3}

$= \frac{36}{10} \times 10^3 \div \left(9 \times \frac{1}{10^2}\right) = \frac{36}{10} \times 10 \times 10 \times 10 \times \frac{1}{9} \times 10^2$

$= 4 \times 10^2 \times 10^2 = 4 \times 10^4$

PSI GK - 1/1/2017

116. જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ?

A)CBSPEB B)CBQNEB C)DBRTFB D)CDTPFD

117. A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
1. A રસોઈયાની સામે બેઠો છે. 2. B નાઈની જમણે બેઠો છે.
3. દરજીની ડાબે ધોબી બેઠો છે. 4. Cની સામે D બેઠા છે.
A અને Bનો વ્યવસાય શું છે ?

A)દરજી અને નાઈ B)દરજી અને રસોઈયો
C)નાઈ અને રસોઈયો D)ધોબી અને રસોઈયો

દરજી	નાઈ	રસોઈયો	ધોબી	
A	C	B	D	અથવા
A	D	B	C	
દરજી	નાઈ	રસોઈયો	ધોબી	

118. ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર હશે.

A)21 વર્ષ B)18 વર્ષ C)15 વર્ષ D)9 વર્ષ

ત્રણ બાળકોની સરેરાશ ઉંમર = 15 વર્ષ

આથી ત્રણેયની ઉંમરનો સરવાળો = સંખ્યા × સરેરાશ

= 3 × 15 વર્ષ

= 45 વર્ષ

= 45 વર્ષ / 15 ભાગ

તેથી 1 ભાગ = 3 વર્ષ

45 વર્ષ

3 : 5 : 7 = 15 ભાગ

↓ ×3 વર્ષ

9 વર્ષ


119. **કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે 'તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે' તો તે વ્યક્તિ કોણ છે ?**

A) રામના પિતા B) રામના કાકા

C) રામનો સાળો D) રામનો ભાઈ

રમેશ, રામની માતાનો પૌત્ર છે. જ્યારે રમેશ, કોઈ વ્યક્તિનો પુત્ર છે.

તો કહી શકાય કે, વ્યક્તિનો પુત્ર રમેશ રામની માતાનો પૌત્ર છે. જે સાબિત કરે છે કે તે વ્યક્તિ રામનો ભાઈ છે.



120. **10% નફે કોઈ પુસ્તકને રૂ.220માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ?**

A) 220 B) 200 C) 210 D) 240

$$\text{મૂ.કિ.} = \frac{100}{100+\text{નફો}\%} \times \text{વે.કિ.} = \frac{100}{110} \times 220 = 200₹$$

121. **ટેંકનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતાં ટેંક 4/5 ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ?**

A) 120 લિટર B) 100 લિટર C) 80 લિટર D) 75 લિટર

ટેંકની ક્ષમતા = X લિટર

$\frac{3}{4}x + 5 = \frac{4}{5}x$ $\frac{4}{5}x - \frac{3}{4}x = 5$


$\frac{16x - 15x}{20} = 5$ $x = 5 \times 20$

$x = 100$

122. **અમીત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?**

A) દક્ષિણ B) દક્ષિણ પશ્ચિમ

C) દક્ષિણ પૂર્વ D) ઉત્તર પૂર્વ



આકૃતિને આધારે કહી શકાય કે અમીતનું મોઢું દક્ષિણ-પૂર્વમાં હશે.

123. **જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતા 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?**

A) 36 B) 40 C) 44 D) 48

જહાંગીર = 18 વર્ષ

અકબર = 50 વર્ષ

ધારો કે X વર્ષની ઉંમર બંનેમાંથી ઘટાડતાં, અકબરની ઉંમર જહાંગીરથી 5 ગણી થશે.

$5(18 - x) = 50 - x$

$90 - 5x = 50 - x$ અકબરની ઉંમર ત્યારે = 50-X

$90 - 50 = -x + 5x$ = 50 - 10

$40 = 4x$ = 40 વર્ષ

$\frac{40}{4} = x$

$x = 10$

124. **A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાલી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ?**

A) E B) D C) A D) C

પંજાબી	સિંધી	ગુજરાતી	તમિલ	બંગાલી
A, B, C	A, B, E	A, B, E, C	A, E	B, C

તો કહી શકાય કે પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી A હશે.

125. **શિલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે ?**

A) 3.5 B) 4.5 C) 5 D) 7

90 મીટર ⟶ 2 મિનિટ

225 મીટર ⟶ ?

$= \frac{225 \times 2}{90} = 5$ મિનિટ

126. **11 ખુરશીઓની કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?**

A) રૂ.30 B) રૂ.60 C) રૂ.66 D) રૂ.90

ખુરશી = X, ટેબલ = Y

11X = 3Y

11/3 X = Y

એક ખુરશી અને એક ટેબલની કિંમત 140 રૂ. છે.

X + Y = 140 ₹

X + 11/3 Y = 140

$\frac{3X + 11X}{3} = 140$


14X = 420

$X = \frac{420}{14}$ **X = 30 ₹**

PSI GK - 4-3/5-3/2017

127. જો B કહે કે તેની માતા, Aની માતાની એકમાત્ર દીકરી છે, તો A નો B સાથે શું સંબંધ છે ?


A) પુત્ર B) પિતા C) દાદા D) મામા



આકૃતિને આધારે કહી શકાય કે Aનો B સાથે મામાનો સંબંધ છે.


128. તમે ઉત્તર તરફ જઈ, જમણે વળી, પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?

A) ઉત્તર B) દક્ષિણ C) પૂર્વ D) પશ્ચિમ



129. રોહન ઉત્તર તરફ 3 કિમીનું અંતર ચાલે છે, પછી ડાબે વળીને 2 કિમી ચાલે છે. તે ફરી ડાબે વળીને 3 કિમી ચાલે છે. આ બિંદુએ તે ડાબે વળીને 3 કિમી ચાલે છે. તેના આરંભિક બિંદુથી હવે તે કેટલા કિલોમીટર દૂર છે ?


A) 1 કિમી B) 2 કિમી C) 3 કિમી D) 5 કિમી



આકૃતિને આધારે કહી શકાય કે રોહન આરંભિક બિંદુથી 1 કિ.મી. દૂર છે.

130. રમાકાંત ઉત્તર તરફ ચાલે છે થોડી વાર પછી તે જમણે વળીને, પછી થોડો આગળ જઈને ડાબે વળે છે. 1 કિમીનું અંતર ચાલ્યા બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે?

A) ઉત્તર B) દક્ષિણ C) પૂર્વ D) પશ્ચિમ



આકૃતિનો આધારે કહી શકાય કે રમાકાંત પશ્ચિમ દિશામાં જઈ રહ્યો છે.


પ્રશ્ન ક્રમાંક 131 થી 135 માટે :

છ વ્યક્તિઓ A, B, C, D, E અને F ગોળ ટેબલને ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોઢુ રાખીને બેઠા છે.

1) A અને Fની વચ્ચે C બેઠો છે.

2) Eને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે.

3) F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે.



131. ક્યા બે વ્યક્તિઓની વચ્ચે D બેઠો છે ?

A) F અને B B) E અને B C) C અને B D) A અને B

132. Aની સામે કોણ બેઠું છે ?

A) F B) C C) E D) આપેલામાંથી કોઈપણ નહીં

આપેલામાંથી કોઈપણ નહીં કારણ કે Aની સામે B છે જે વિકલ્પમાં નથી.

133. નીચેનામાંથી કોણ A ની જમણી બાજુ બેઠો છે ?

A) E B) F C) B D) D

Aની જમણી બાજુ E છે.

134. Eની સામે કોણ બેઠું છે ?

A) A B) B C) C D) F

Eની સામે F બેસેલ છે

135. ક્યા બે વ્યક્તિઓની વચ્ચે F બેઠો છે ?

A) C અને D B) C અને A C) C અને B D) C અને E

C અને Bની વચ્ચે F બેઠો છે.

136. 8.30 કલાકે મિનીટ અને કલાકના કાંટા વચ્ચે .... ખૂણો હશે.

A) 80° B) 60° C) 75° D) 105°

કલાકના અને મિનિટના કાંટા વચ્ચેનું અંતર 5 મિનિટ હોય, ત્યારે 30° ખૂણે બને છે.

તો 8:30 કલાકે (30+30+15) 75°નો ખૂણો હશે.

137. નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યા શોધો :

4, 7, 11, 18, 29, 47, ...

A) 63 B) 72 C) 76 D) 80

138. નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યાને શોધો :

2, 6, 12, 20, 30, ...

A) 42 B) 44 C) 46 D) 48

પ્રશ્ન ક્રમાંક 139 થી 144 માટે :

A, B, C, D, E અને F ગોળ ટેબલને ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોઢુ રાખીને બેઠા છે.

1) A ની સામે B છે. 2) E ની જમણી બાજુ B છે.

3) C ની ડાબી બાજુ B છે. 4) D ની ડાબી બાજુ C છે.

5) A ની જમણી બાજુ F છે.

આ પછી D અને F એક બીજાની જગ્યાએ બેસે છે અને E અને B એક બીજાની જગ્યાએ બેસે છે.

139. Dની ડાબી બાજુ કોણ બેઠું છે ?

A) B B) D C) E D) A

140. Cની ડાબી બાજુ કોણ બેઠું છે ?

A) E B) F C) A D) B

141. Dની સામે કોણ બેઠું છે ?

A) C B) F C) A D) B

142. Cની સામે કોણ બેઠું છે ?


A)C B)D C)B D)A

143. Bની સામે કોણ બેઠું છે ?

A)A B)C C)D D)F

144. Bની જમણી બાજુ કોણ બેઠું છે ?

A)F B)E C)C D)D



D અને F, E અને B એકબીજાની જગ્યાએ બેસે છે.

145. અમુક કોડમાં INSTITUTION ને NOITUTITSNI લખવામાં આવ્યું છે. તે કોડમાં PERFECTION કેવી રીતે લખાશે ?

A)NOICTEFREP B)NOITCEFERP

C)NOITCEFRPE D)NOITCEFREP

શબ્દ = I N S T I T U T I O N

કોડ = N O I T U T I T S N I

આપેલ શબ્દના દરેક મૂળાક્ષરને કોડમાં રૂપાંતર કરતાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખ્યાં છે. એટલે કે, તેમની વચ્ચે ત્રાંસો (Cross) સંબંધ છે.

શબ્દ = P E R F E C T I O N

કોડ = N O I T C E F R E P

146. અમુક કોડમાં GIGANTIC ને GIGTANCI લખવામાં આવ્યું છે. તે કોડમાં MIRACLES કેવી રીતે લખાશે ?

A)MIRLCAES B)MIRLACSE

C)RIMCLASE D)RIMLCAES

શબ્દ = G I G | A N T | I C આપેલ શબ્દના મૂળાક્ષરને

કોડ = G I G | T A N | I C કંઈક ઉપર પ્રમાણે સંબંધ છે.

શબ્દ = M I R | A C L | E S

કોડ = M I R | L A C | S E

147. અમુક કોડમાં BOXER ને AQWGQ લખવામાં આવ્યું છે. તે કોડમાં VISIT કેવી રીતે લખાશે ?

A)UKRKU B)UKRKS C)WKRKU D)WKRKS

-1 +2 -1 +2 -1

શબ્દ = B O X E R

↓ ↓ ↓ ↓ ↓

કોડ = A Q W G Q

આપેલ શબ્દના મૂળાક્ષરને કોડ સાથે કંઈક ઉપર પ્રમાણે સંબંધ છે.

-1 +2 -1 +2 -1

શબ્દ = V I S I T

↓ ↓ ↓ ↓ ↓

કોડ = U K R K S

148. જો ROSEનો કોડ 6821, CHAIRનો કોડ 73456 અને PREACE નો કોડ 961471 હોય, તો SEARCHનો કોડ શું હશે ?

A)246173 B)216473 C)214763 D)214673

R O S E C H A I R

↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓

6 8 2 1 7 3 4 5 6

P R E A C E

↓ ↓ ↓ ↓ ↓ ↓

9 6 1 4 7 1

આપેલ શબ્દના દરેક મૂળાક્ષર સામે આપેલ નંબરને ઉદેશે છે. તો,

શબ્દ = S E A R C H

↓ ↓ ↓ ↓ ↓ ↓

કોડ = 2 1 4 6 7 3

149. અમુક કોડમાં SOCIAL ને TQFMFR લખવામાં આવ્યું છે. તો તમે DIMPLE માટે શું કોડ લખશો ?

A)EKPTOK B)EKPQPJ C)EKPSPJ D)EKPSOH

+1 +2 +3 +4 +5 +6

શબ્દ = S O C I A L

↓ ↓ ↓ ↓ ↓ ↓

કોડ = T Q F M F R

આ શબ્દના દરેક મૂળાક્ષરને કોડ સાથે સીધો સંબંધ છે.

+1 +2 +3 +4 +5 +6

શબ્દ = D I M P L E

↓ ↓ ↓ ↓ ↓ ↓

કોડ = E K P T Q K

150. શબ્દકોશમાં નીચેના પાંચ શબ્દોમાંથી પ્રથમ શબ્દો કયો આવશે?

SPINE, SPINAL, SPINNER, SPINET, SPINDLE

A)SPINET B)SPINNER C)SPINAL D)SPINDLE

શબ્દકોશમાં, શબ્દોની ગોઠવણી,

1) SPINAL 2) SPINDLE 3) SPINE 4) SPINET 5) SPINNER

151. શબ્દકોશમાં નીચેના પાંચ શબ્દોમાંથી પ્રથમ શબ્દો કયો આવશે?

GRADINE, GRADIENT, GRADUATE, GRADING, GRADUAL

A)GRADUAL B)GRADIENT

C)GRADINE D)GRADUATE

શબ્દકોશમાં, શબ્દોની ગોઠવણી,

1) GRADIENT 2) GRADINE

3) GRADING 4) GRADUAL

5) GRADUATE

152. શબ્દકોશમાં કયો શબ્દ શબ્દકોશમાં છેલ્લો આવશે ?
UNIMPORTANT, UNDERSTAND, UNNECESSARY, UNCETAIN, UNETHICAL
A) UNETHICAL B) UNIMPORTANT
C) UNDERSTAND D) UNNECESSARY
શબ્દકોશમાં, શબ્દોની ગોઠવણી,
1) UNCETAIN 2) UNDERSTAND
3) UNETHICAL 4) UNIMPORTANT
5) UNNECESSARY

153. શબ્દકોશમાં કયો શબ્દ શબ્દકોશમાં છેલ્લો આવશે ?
SPORT, SPOUSE, SPORADIC, SPROUT
A) SPORADIC B) SPOUSE
C) SPROUT D) SPORT
શબ્દકોશમાં, શબ્દોની ગોઠવણી,
1) SPORADIC 2) SPORT
3) SPOUSE 4) SPROUT

154. મોહન 10.2 કિમી અંતરને 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલું અંતર કાપી લેશે ?
A) 15 km B) 17 km C) 19 km D) 21 km

ઝડપ $= \frac{\text{અંતર}}{\text{સમય}} = \frac{10.2}{3} = 3.4$ કિ.મી./કલાક

5 કલાકમાં કપાયેલ અંતર,
$=$ ઝડપ × સમય $= 3.4 \times 5$
$= 17$ કિ.મી./કલાક

155. એક ટ્રેન 92.4 કિમી / કલાકની ઝડપે ચાલે છે. તે ટ્રેન 10 મિનીટમાં કેટલું અંતર કાપશે ?
A) 14500 મીટર B) 15400 મીટર
C) 15200 મીટર D) 14700 મીટર
ટ્રેનનું 10 મિનિટમાં કપાયેલ અંતર,
$=$ સમય × ઝડપ
$= 10$ મિનિટ $\times \frac{92.4 \times 1000 \text{ મીટર}}{60 \text{ મિનિટ}}$
(1 કિ.મી. = 1000 મીટર)
$= 154 \times 100$ મીટર $= 15400$ મીટર

156. છૂટી ગયેલા અક્ષરને શોધો.
U O I __ A
A) E B) C C) S D) G
U O I E A
આપેલ મૂળાક્ષર શ્રેણીમાં સ્વર છે, જે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગોઠવ્યા છે.

157. છૂટી ગયેલા અક્ષરોને શોધો.
Y W U S Q __ __
A) N J B) M L C) O M D) J R
-2 -2 -2 -2 -2 -2
Y W U S Q O M
આપેલ મૂળાક્ષર શ્રેણીમાં દરેક મૂળાક્ષર વચ્ચે 'બે'નો તફાવત છે.


158. છૂટી ગયેલા અક્ષરોને શોધો.
AZ, BY, CX, __ __
A) EF B) JH C) DW D) DE
AZ, BY, CX, DW
આપેલ મૂળાક્ષર શ્રેણીમાં એકબીજાના વિરુદ્ધ મૂળાક્ષરોની જોડી છે.

કોન્સ્ટેબલ - 23/10/2016

159. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો.
3, 4, 9, 6, 27, 8, ...
A) 64 B) 10 C) 81 D) 54

160. સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાન : દિવાલ : : દેશ : ?
A) સરહદ B) રાજ્ય C) સમુદ્ર D) સૈન્ય
આપેલ માહિતીને આધારે કહી શકાય કે, મકાનની ફરતે જેમ દિવાલ હોય છે, તેમ દેશની ફરતે સરહદ હોય છે.

161. એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે ?
A) પુરુષની બહેન છે. B) પુરુષની મા છે.
C) પુરુષની દીકરી છે. D) પુરુષની દાદી છે.



આકૃતિને આધારે કહી કાય કે સ્ત્રીનો પુરુષ સાથે બહેનનો સંબંધ છે.

162. જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે ?
A) રવિવાર B) બુધવાર C) ગુરુવાર D) શુક્રવાર
જો 1 જાન્યુઆરી, 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી, 2015ના રોજ ગુરુવાર હોય.
કેમ કે વર્ષ 2014એ સામાન્ય વર્ષ છે.

163. 10 માણસ એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?
A) 20 B) 50 C) 100 D) 200
$M_1D_1 = M_2D_2$ $M_1 = 10$ માણસ
$10 \times 10 = M_2 \times 1$ $D_1 = 10$ દિવસ
$100 = M_2$ માણસ $M_2 = ?$
$D_2 = 1$ દિવસ

164. કઈ સંખ્યા સૌથી મોટી છે ?
A) -10 B) -20 C) -30 D) -40
$-10 > -20 > -30 > -40$
સૌથી મોટી સંખ્યા $= -10$
સૌથી નાની સંખ્યા $= -40$

165. 1000 x 0.05 x 0.01 x100

A) 0.5 B) 5 <u>C) 50</u> D) 500

$= 1000 \times 0.05 \times 0.01 \times 100$

$= 100 \times \frac{5}{100} \times \frac{1}{100} \times 100 \quad = 50$

166. 400 ÷ 50 + 3000 - 200 + 6

<u>A) 3256</u> B) 3656 C) 3156 D) 3356

$= \underline{400 \div 50 + 3000} - \underline{200 + 6}$

$= 3450 - 194$

$= 3256$

OR

$= \underline{400 \div 50 + 3000} - 200 + 6$

$= \underline{3450 - 200} + 6$

$= 3256$

કોન્સ્ટેબલ - 2015

167. જયશે એક સાયકલ રૂ.1200માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું ?

A) 7 % <u>B) 8 %</u> C) 9 % D) 10.95

મૂ.કિ. = 1200 ₹

વે.કિ. = 1104 ₹

નુકશાન = મૂ.કિ. - વે.કિ.

= 1200 - 1104

= 96 ₹

$\%\text{નુકશાન} = \frac{\text{નુકશાન}}{\text{મૂ.કિ.}} \times 100 = \frac{96}{1200} \times 100 = 8\%$

168. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?

A) 4 B) 5 <u>C) 6</u> D) 7

$M_1D_1 = M_2D_2$ M_1 = 12 માણસ

$12 \times 9 = 18 \times D_2$ D_1 = 9 દિવસ

$\frac{12 \times 9}{18} = D_2$ M_2 = 18 માણસ

D_2 = ?


D_2 = 6 દિવસ

169. 1, 4, 9, 16..........?

<u>A) 25</u> B) 30 C) 32 D) 45

170. કોઈપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ?

A) 13 B) 15 C) 22 <u>D) 25</u>



હારમાં કુલ માણસોની સંખ્યા = 25

(13 + 13 = 26 - 1 = 25)

171. ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?

A) મંગળવાર B) બુધવાર <u>C) ગુરૂવાર</u> D) શુક્રવાર

જો આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે 'ગુરૂવાર' આવે.

172. મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાતાં કહે છે કે- આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે તો આ છોકરી મહેશની શું સગી થાય ?

A) માતા <u>B) બહેન</u>

C) પત્ની D) પિતરાઈ બહેન

મહેશના દાદાના એકના એક પુત્ર, એટલે મહેશના પિતા. અને મહેશના પિતાની પુત્રી છે, એટલે કે તે છોકરી મહેશની બહેન થાય.

173. મીણબત્તી-મીણ તો કાગળ.....?

<u>A) વૃક્ષ</u> B) ચોપડી C) પસ્તી D) લખવું

આપેલ માહિતીને આધારે કહી શકાય કે, મીણબત્તી બનાવવા માટે મીણ મદદરૂપ છે તેમ કાગળ બનાવવા માટે વૃક્ષ મદદરૂપ છે.

174. A, D, H, K, O..................

A) Q <u>B) R</u> C) S D) T

+3 +4 +3 +4 +3

A D H K O R

આપેલ મૂળાક્ષર શ્રેણીમાં દરેક મૂળાક્ષરને ઉપર પ્રમાણે સંબંધ છે.

175. આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરૂવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો ?

A) મંગળવાર B) બુધવાર C) રવિવાર <u>D) સોમવાર</u>

આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું, એટલે કે આજે મંગળવાર છે તો ગઈકાલે સોમવાર ગયો કહેવાય.

બિન સચિવાલય કલાર્ક - 2016


177. આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.

23,29,37

A) 13,15,23 B) 17,21,29 C) 31,37,49 <u>D) 41,47,55</u>

178. અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે, તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે.જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે.તો સ્ટેશન પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?

A) 11 km/hr B) 5.5 km/hr C) 7.5 km/hr D) 6.0 km/hr



$t_1 - t_2 = 15$ મિનિટ

$\frac{\text{અંતર}}{\text{ઝડપ}} - \frac{\text{અંતર}}{\text{ઝડપ}} = \frac{15}{60}$ કલાક

$\frac{x}{5} - \frac{x}{6} = \frac{1}{4}$ કલાક

$x = \frac{30}{4} = 7.5\ km$

179. શ્રેણી પૂર્ણ કરો.

10,29,66,127.......

A) 169 B) 218 C) 223 D) 178

180. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે.બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા, પાસ થવા લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ?

A) 360 B) 400 C) 420 D) 500

વિદ્યાર્થીના ગુણની ટકાવારી

32% ——→ 20 માર્ક્સથી નાપાસ

42% ——→ 30 માર્ક્સથી પાસ

(42%-32%)=10% ——→ 50 માર્ક્સનો તફાવત

10% માર્ક્સ = 50 માર્ક્સ

100% માર્ક્સ = ?

$= \frac{100 \times 50}{10} = 500$

181. જો ABCD માં A-Z, 1-26 મુજબ હોય અને AHMEDABAD = -7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ...

A) -37 B) 78 C) 69 D) -47

1 8 13 5 4 1 2 1 4

A H M E D A B A D = -7

1 + 8 - 13 + 5 - 4 + 1 - 2 + 1 - 4 = -7

16 1 12 1 14 21 18

P A L A N U R = -5

16 + 1 - 12 + 1 - 14 + 21 - 18 = -5

19 21 18 5 14 4 18 1 14 1 7 1 18

S U R E N D R A N A G A R = -37

19 + 21 - 18 + 5 - 14 + 4 - 18 + 1 - 14 + 1 - 7 + 1 - 18 = -37

જવાબ : A

બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014

182. રૂ. 315 = ... ના 90%

A) રૂા. 355 B) રૂા. 352 C) રૂા. 348 D) રૂા. 350

315 = X ના 90% 315 = X × 90/100

3150/9 = X X = 350 રૂ.

183. એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 75 રનં અને અંતિમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 35 રન છે. જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 રન હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે ?

A) 50 B) 55 C) 110 D) 105

સંખ્યા × સરેરાશ = સરવાળો

11 × 50 રન = 550 રન

પ્રથમ છ માસ= 6 × 75 રન = 450 રન

અંતિમ છ માસ= 6 × 35 રન = 210 રન

છઠ્ઠા ખેલાડીના રન = (450 + 210) - 550

= 660 - 550

= 110 રન

184. 2 વર્ષ પહેલાં માતા-પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો .... વર્ષ થશે.

A) 50 B) 46 C) 40 D) 60

2 વર્ષ પહેલા,

માતા-પિતા અને પુત્રીઓની ઉંમરનો સરવાળો = 40 વર્ષ

આથી, હાલ આ ઉંમરનો સરવાળો = 40 + (4×2 વર્ષ)

= 40 + 8 = 48 વર્ષ

3 વર્ષ બાદ,


માતા-પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો

= 48 વર્ષ + (4×3 વર્ષ)

= 48 + 12 = 60 વર્ષ

185. 6% લેખે રૂ. 6,000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. .... થાય.

A) 360 B) 381.60 C) 741.60 D) 6381.60



તેથી બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ = 360 રૂ. + 21.6 રૂ. = 381.6 રૂ.

186. એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

A)30 B)40 C)50 D)20

ધારો કે દર્દીઓની સંખ્યા = X

દરેકને 3 સફરજન આપવામાં આવે તો 3X સફરજન વહેંચાય.

જો 25 બાળદર્દી વધે, તો (X + 25) સંખ્યા બને.

આથી હવે સફરજન 2(X+25) વહેંચાય.

3X = 2 (X+25) 3X = 2X + 50 3X-2X = 50

X = 50

187. 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના .... ભાગનું વ્યાજ મળે.

A)30 B)130 C) $\frac{3}{10}$ D) $\frac{13}{10}$

જ્યાં R = 10% N = 3 વર્ષ

સાદું વ્યાજ $= \frac{P \times R \times N}{100} = \frac{P \times 10 \times 3}{100} = \frac{3}{10} \times P$

એટલે કે, રોકાણના 3/10 ભાગનું વ્યાજ મળે.

188. એક વસ્તુ રૂ. 720માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ. ________માં વેચવી જોઈએ.

A)120 B)660 C)60 D)600

	વે.કિ.	
20% નફો	120%	
10% નફો	110%	
વે.કિ.(%)	વે.કિ. (રૂ.માં)	$= \frac{110 \times 720}{120}$
120%	720 રૂ.	
110%	?	= 660 રૂ.

189. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(દરેક સંખ્યા પૂર્ણઘન છે.)

A)4096 ના ઘનમૂળના એકમનો અંક 6 છે.

B)15625 ના ઘનમૂળના એકમનો અંક 5 છે.

C)12167 ના ઘનમૂળના એકમનો અંક 7 છે.

D)13824 ના ઘનમૂળના એકમનો અંક 4 છે.

વિકલ્પ C ખોટું વિધાન છે.

કેમ કે, $3^3 = 27$ થાય આથી જો પૂર્ણઘનનો એકમ અંક 7 હોય, તો ઘનમૂળનો એકમ અંક 3 આવે.

GPSC પ્રિલિમ - 2001

190. તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા અને પછી જમણે ફંટાયા ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણે ફંટાયા અને પછી થોડું આગળ ચાલીને ઉંધી દિશામાં ચાલવા લાગ્યા - કઈ દિશા તરફ?

A)દક્ષિણ B)પશ્ચિમ

C)ઉત્તર

D)ચાલેલા અંતરની વિગતો વગર કહી શકાય નહીં



191. એક ધનિક પાસે જેટલા લાખ રૂપિયા છે તેને બમણા કરી તેમાં પાંચ લાખ રૂ.ઉમેરીએ તો 8મી જુલાઈ પછી જુલાઈના બાકી રહેતા દિવસો જેટલા લાખ રૂ. થાય તો તેની પાસે કેટલા લાખ રૂપિયા હશે ?

A)9.5 B)9 C)14 D)10

ધનિક પાસે ધારો કે X રૂ. હશે.

8મી જુલાઈ પછી બાકી રહેતા દિવસો = 31-8 = 23 દિવસ

તેથી 2X + 5 = 23 લાખ

2X = 23 - 5 2X = 18 X = 18/2 = 9 લાખ

191. મારો નાનો ભાઈ એક વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા સાત ગણી હતી. જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે ?

A)5 B)6 C)7 D)8

નાનો ભાઈ = 1 વર્ષ

મારી ઉંમર = 7 વર્ષ (તેથી 7 ગણી)

હવે, X વર્ષ પછી મારી ઉંમર બમણી હોય, તો

$\frac{1 + X}{7 + X} = \frac{1}{2}$ (તેથી 1:2 કરવી છે.)

2 + 2X = 7 + X

X = 7-2 = 5 વર્ષ

તેથી નાના ભાઈની હાલની ઉંમર,

= 1 + X વર્ષ = 1 + 5 = 6 વર્ષ

192. A, B, C અને D એમ ચાર વ્યક્તિઓ એકબીજાની પાછળ પણ એ ક્રમમાં નહી ઉભી છે. D વ્યક્તિ C અને Aથી આગળ છે. B વ્યક્તિ Cની તુરંત જ પાછળ છે. A વ્યક્તિ Bની આગળ છે. તો તે કયા ક્રમમાં ઉભા હશે ?

A)ABCD B)ABDC C)DACB D)DCAB

આપેલ માહિતીને આધારે કહી શકાય કે A, B, C અને D એમ ચાર વ્યક્તિઓનો ક્રમ DACB રહેશે.

PSI ખાતાકીય - 23/04/2017

193. 1000 રૂ.નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે ?

A)રૂ.110 B)રૂ.210 C)રૂ.100 D)રૂ.120

P = 1000 રૂ. N = 2 વર્ષ R = 10%

P = 1000 રૂ.

10% 10%

100 રૂ. 100 રૂ.

10%

10 રૂ.

ચક્રવૃદ્ધિ વ્યાજ = 100 રૂ. + 100 રૂ. + 10 રૂ. = 210 રૂ.

194. એક છોકરીના પરિચય આપા કવને કહ્યું કે એ એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે. કવનને એ છોકરી સાથે શું સંબંધ છે ?

A) કાકા   B) પિતા   C) ભાઈ   D) પતિ

કવન કહે છે કે,

'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.'

↓

(કવનની સાસુની એકની એક છોકરી એટલે કવનની પત્ની.)

હવે પહેલાનું વાક્ય જોડતાં,

'એની માતા, કવનની પત્ની છે'


તો કવન એ છોકરી સાથે પિતાનો સંબંધ ધરાવે છે.

195. શ્રેણી પૂર્ણ કરો.

3, 10, 29, 66 ....

A) 83   B) 127   C) 160   D) 98

196. નીચે દર્શાવેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે ?



A) 18   B) 19   C) 25   D) 23

(9 થી 11) નંબર દર્શાવતી આકૃતિમાં કુલ 14 ચોરસ છે.

અને તે નંબરને બાદ કરતાં બાકીની આકૃતિમાં કુલ 9 ચોરસ છે.

એમ કુલ 14 + 9 = 23 ચોરસ છે.

197. અલકા, માલમ કરતાં વધુ ઉંમરની છે. ગોપાલ, માલા કરતા વધુ ઉંમરનો છે પણ અલકા કરતા ઓછી ઉંમરનો છે. કપિલની ઉંમર રામ અને માલા કરતાં ઓછી છે અને માલા રામ કરતાં વધુ ઉંમરની છે. તો ઉંમરની દૃષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે ?

A) રામ   B) માલા   C) અલકા   D) કપિલ

આપેલ માહિતીને આધારે એક શક્યતા નીચે મુજબ છે.

↓ ↓

અલકા > માલમ > ગોપાલ > માલા > રામ > કપિલ

તો કહી શકાય કે ઉંમરની દૃષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે માલા આવશે.

198. રાધાબેન બેંકમાં રૂ.17000નું એક વર્ષનું સાદુ વ્યાજ રૂ.1190 મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

A) 7%   B) 17 %   C) 11%   D) 6%

રકમ P = 17000 ₹   સાદુ વ્યાજ = 1190 ₹

સમય N = 1 વર્ષ   વ્યાજદર R = ?

સાદુ વ્યાજ $= \frac{P \times R \times N}{100}$

$1190 = \frac{1700 \times R \times 1}{100}$ $R = \frac{1190}{170}$ **R = 7%**

199. DEPRESSION શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલ બદલ કરવામાં આવે. તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર તથા પાંચમો અને છઠ્ઠો અક્ષર, અને એ જ રીતે છેક સુધી અદલ બદલ કરો. મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડીક્ષનરી પ્રમાણે ગોઠવો. હવે મળેલા શબ્દમાં જમણેથી સાતમો અક્ષર કયો હશે ?

A) R   B) O   C) S   D) I

શબ્દ :   D E P R E S S I O N

E D R P S E I S N O

અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે = D E E I N O P R S S

← 7 6 5 4 3 2 1

મળેલ શબ્દમાં જમણેથી સાતમો અક્ષર 7 છે.

200. એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ..........છાપેલી કિંમત હોય.

A) 10   B) 20   C) 5   D) 50

% વળતર = 10%   વળતર (રૂમાં) = 5 રૂ.

છાપેલી કિંમત = ?

છાપેલી કિંમત × 10% = 5   છાપેલી કિંમત × 10/100 = 5

છાપેલી કિંમત = 5×10 = 50 રૂ.

201. $\frac{2}{x} - \frac{1}{x} = 5$ છે તો x ....

A) 5   B) 1/5   C) 10   D) 2/5

$\frac{2}{X} - \frac{1}{X} = 5$ $\frac{2-1}{X} = 5$ $\frac{1}{X} = 5$ $X = \frac{1}{5}$

202. પ્રશ્નાર્થ વાળા ખાનામાં યોગ્ય જવાબ દર્શાવો.

આકૃતિ 1	આકૃતિ 2	આકૃતિ 3
6, 4, 34, 5, 9	8, 6, ?, 3, 7	8, 3, 45, 9, 9

A) 21   B) 38   C) 27   D) 18

આપેલ પ્રથમ આકૃતિ : [(6×9) - (5×4)] = 34

આપેલ ત્રીજી આકૃતિ : [(8×9) - (9×3)] = 45

તે જ રીતે બીજી આકૃતિમાં : [(8×7) - (3×6)] = 38 આવશે.

ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016


203. $\sqrt[3]{\sqrt{64}}$ = ...

A) 1   B) 2   C) 4   D) 8

$\sqrt[3]{\sqrt{64}} = \sqrt[3]{8} = 2$

204. મુકેશનીમાં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના શું થાય?

A) કાકા   B) પિતા   C) ભાઈ   D) દાદા



તો રીટાના પતિ મુકેશના પિતા થાય.

205. રૂ.6000 નું 6% ના દરે 3 માસનું વ્યાજમુદ્દલ શું થાય?

A)90 B)1080 C)6090 D)7080

P = 6000 ₹ R = 6% N = 3 માસ = 3/12 વર્ષ


સાદું વ્યાજ $= \frac{P \times R \times N}{100} = \frac{6000 \times 6 \times 3}{100 \times 12} = 90$ રૂ.

વ્યાજ મુદ્દલ = મુદ્દલ + વ્યાજ

= 6000 + 90 = 6090 રૂ.

206. ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે?

A)નૈઋત્ય B)અગ્નિ C)વાયવ્ય D)ઈશાન



જો, મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો નૈઋત્ય દિશામાં હશે.

207. એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય?

A)40 % B)42 % C)45 % D)48 %

2000માંથી 800 હાજર હોય, તો

હાજરીની ટકાવારી = 800/2000 × 100 = 40%

208. $-\frac{1}{5}$ ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય?

A)7 B)3 C)-9 D)-3

- 1/5 ની વિરોધી સંખ્યા = + 1/5

+1/5 ની વ્યસ્ત સંખ્યા = 5

હવે, 5માં 4 ઉમેરતા, 5 + 4 = 9 થશે. આ 9નું વર્ગમૂળ = 3

209. ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી છે?

A)9999 B)9000 C)1000 D)9990

ચાર અંકની કુલ સંખ્યા, 1000 થી 9999 = 9000

210. પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?

A)1 B)11111 C)11 D)89999

છ અંકની નાનામાં નાની સંખ્યા = 100000

પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા = 99999

1

211. 495 માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત કેટલો થાય?

A)400 B)491 C)360 D)396

495ની સંખ્યામાં,

4ની સ્થાન કિંમત = 400


4ની અંક કિંમત = 4

396

212. 8 પેનની વે.કિ. 12 પેનની મૂ.કિ. જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય?

A)20 % B)25 % C)50 % D)40 %

8 પેનની વે.કિ. = 12 પેનની મૂ.કિ.



મૂ.કિ. = 8 ₹ વે.કિ. = 12 ₹

નફો = વે.કિ. - મૂ.કિ.

= 12 ₹ - 8 ₹ = 4 ₹

$\%\text{નફો} = \frac{\text{નફો}}{\text{મૂ.કિ.}} \times 100$

$\%\text{નફો} = \frac{4}{8} \times 100 = 50\%$

213. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય?

A)ચાર B)ત્રણ C)બે D)એક

214. એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય?

A) $\frac{1}{\pi}$ B)π C)2πr D)πr^2

વર્તુળનો પરિઘ = 2πr

વર્તુળનો વ્યાસ = 2r

$\frac{\text{પરિઘ}}{\text{વ્યાસ}} = \frac{2\pi r}{2r} = \pi$

PSI/ASI GK - 2/5/2015

215. રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઈ હશે ?

A)20 B)18 C)15 D)16

જો રક્ષાનો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે અને જો મહિનો સોમવારથી શરૂ થાય તો,

મહિનાની તારીખ 1 = સોમવાર, 8 = સોમવાર, 15 = સોમવાર, 16 = મંગળવાર, 17 = બુધવાર, 18 = ગુરુવાર

તો રક્ષાની જન્મ તારીખ 18 હશે.

216. એક સ્ત્રીની ઓળખ આપતા રવિએ કહ્યું તેની માતાએ મારી સાસુની એકની એક પુત્રી છે. તો રવિનો એ સ્ત્રી સાથે શું સંબંધ હશે ?

A)ભાઈ B)પિતા C)પિતરાઈ D)કાકા

રવિના સાસુની એકની એક પુત્રી એટલે રવિની પત્ની.


હવે પહેલાનું વાક્ય જોડતાં

'તેની માતા, એ રવિની પત્ની છે'

તો રવિનો એ સ્ત્રી સાથે પિતાનો સંબંધ થશે.

217. રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઈ દિશામાં હશે ?

A)ઉત્તર B)પશ્ચિમ C)પૂર્વ D)દક્ષિણ



તો, કહી શકાય કે રમેશનું મોં ઉત્તર દિશામાં છે.

218. રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?

A)સુજાતા B)પુષ્પા C)બીના D)રમા

આપેલ માહિતીને આધારે, દરેકનો સંબંધ નીચે પ્રમાણે રહેશે.

બીના > રમા > પુષ્પા > બેલા > સુજાતા

તો, આ બધામાં સૌથી ઊંચું બીના રહેશે.

219. શબ્દ INFRASTRUCTURE માંથી નીચેના શબ્દોમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં ?

A)INTACT B)INSTRUCTOR
C)STRUCTURE D)FRITTER

આપેલ શબ્દ INFRASTRUCTURE માંથી INSTRUCTOR શબ્દ બનાવી શકાય નહીં, કેમ કે INSTUCTORમાંનો 'O' મૂળાક્ષર આપેલ શબ્દ INFRASTRUCTUREમાં નથી.

220. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બન્ને કાંટા એકી સાથે કેટલી વાર આવશે ?

A)24 B)11 C)22 D)12

સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બન્ને કાંટા એક સાથે 11 વાર આવશે.

221. જો એક મહિનાનાં ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ?

A)3 B)5 C)4 D)2


જો મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો.

તારીખ	વાર	તારીખ	વાર
4	બુધવાર	5	ગુરુવાર
6	શુક્રવાર	7	શનિવાર
14	શનિવાર	21	શનિવાર

મહિનાના પહેલો બુધવારે 4 તારીખ આવશે.

222. ગોવિંદભાઈને પાંચ પુત્રો છે અને દરેક ભાઈને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?

A)12 B)8 C)10 D)એકપણ નહીં



ઉપરની આકૃતિ પરથી કહી શકાય કે કુટુંબમાં કુલ 8 સભ્યો હશે.

223. 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂ.ના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય ?

A)20 ટકા B)4 ટકા C)5 ટકા D)10 ટકા

નુકસાનની ટકાવારી 100 પર ગણતરી થાય.

આથી 500₹ ના વેપારમાં 20% નુકસાની હોય તો, 100₹ના વેપારમાં પણ નુકસાનીની ટકાવારી 20% જ રહેશે.

224. અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

A)200 રૂપિયા B)225 રૂપિયા
C)224.75 રૂપિયા D)આમાંથી એક પણ નહીં

= 250 - 125 + 75 અઢીસો = 250
= 125 + 75 સવાસો = 125
= 200 ₹ પોણીસો = 75

225. LANDSCAPE શબ્દમાંથી કયો શબ્દ બને છે ?

A)CENTRE B)DANCE C)CAST D)PAGE

LANDSCAPE શબ્દમાંથી DANCE શબ્દ બને, કેમ કે DANCEને બાદ કરતા વિકલ્પમાંના દરેક શબ્દના મૂળાક્ષર LANDSCAPE શબ્દમાં નથી, જેમ કે, 'T', 'G'

226. 2 ઓક્ટોબર 2007ના રોજ શનિવાર છે તો 2 ઓક્ટોબર 2008ના રોજ કયો વાર હશે ?

A)શનિવાર B)રવિવાર C)સોમવાર D)શુક્રવાર

જો 2 ઓક્ટોબર 2007ના રોજ શનિવાર છે તો 2 ઓક્ટોબર 2008ના રોજ સોમવાર હશે.

કેમ કે 2008નું વર્ષ લીપ વર્ષ છે.

227. 100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના ટુકડા કાપતા કેટલો સમય લાગશે ?

A)10 સેકન્ડ B)100 સેકન્ડ
C)1 મીનીટ 30 સેકન્ડ D)50 સેકન્ડ

100 મીટર કાપડના તાકામાંથી

10 મીટરનો એક ટુકડો કાપતાં 10 સેકન્ડ લાગે છે.

આ 100 મીટરમાંથી 10 ટુકડાં કરવા માટે 9 વખત કાતર ચલાવવી પડે.

તેથી ટુકડાં કાપવા લાગતો સમય,

= 10 સેકન્ડ × 9 વખત

= 90 સેકન્ડ = 1 મિનિટ, 30 સેકન્ડ

228. 49, 64, 81, 100, 121, ...

A)153 B)151 C)169 D)144

229. એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ?


A)100 B)20 C)10 D)200

230. ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ?

A)9 B)8 C)7 D)11

231. એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ 8 મો અને પાછળથી 29 મો છે તો કુલ વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે ?

A)60 B)50 C)45 D)54



તો, પાસ થનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા

(29-1=28+8=36)36.

હવે જો, કુલ સંખ્યા

60% વિદ્યાર્થીઓ પાસ થાય ⟶ 36

100% વિદ્યાર્થીઓ પાસ થાય ⟶ ?

$\frac{36 \times 100}{60} = 60$

232. મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

A)ફોઈ B)ભત્રીજી C)બહેન D)ભાણેજી


મારી ફોઈના પિતા - મારા દાદા થાય અને મારા દાદાના પુત્ર એટલે મારા પિતા.

તો પિતાની પુત્રી મારી બહેન થાય.

233. સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે ત્યાર પછી તે ઉત્તર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ?

A)5 કિ.મી. B)10 કિ.મી. C)15 કિ.મી. D)25 કિ.મી.

ઉત્તર



દક્ષિણ

234. 8, 25, 49, 36 કઈ સંખ્યા અન્ય ત્રણેથી જુદી છે ?

A)49 B)25 C)8 D)36

આપેલ સંખ્યામાં 8 ત્રણથી જુદી છે. કારણ કે, 25⟶5નો વર્ગ છે. 49⟶7નો વર્ગ છે, 36⟶6નો વર્ગ છે. જ્યારે 8 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી.

235. 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ?

A)8 B)9 C)10 D)11

$M_1D_1 = M_2D_2$

$150 \times 12 = 200 \times D_2$

$D_2 = \frac{150 \times 12}{200}$

$D_2 = \frac{180}{20}$

$D_2 = 9$ દિવસ

$M_1 = 150$ વ્યક્તિ

$D_1 = 12$ દિવસ

$M_2 = 200$ વ્યક્તિ

$D_2 = ?$

GPSC Class-1 - 2016

નીચે જણાવેલ માહિતીના આધારે પ્રશ્ન-236 થી પ્રશ્ન-240 ના જવાબો આપો.

P, Q, R, S, T, V અને W સાત મિત્રો છે. તેઓ સાત જુદા જુદા શહેર તરફ જવા અઠવાડીયાના અલગ અલગ દિવસે યાત્રા શરૂ કરે છે.

R સોમવારે જયપુર જવા નિકળે છે.

અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે રવિવારે એક જણ બેંગલોર જવા નિકળે છે.

T, W ના પહેલાના દિવસે અને P ની પછીના દિવસે નિકળે છે.

S શુક્રવારે કલકત્તા જવા નિકળે છે. Q હૈદરાબાદ કે બેંગલોર જતો નથી. W દિલ્હી જાય છે. P ચંદીગઢ જાય છે.

સાત શહેર આ મુજબ છે : દિલ્હી, ચેન્નાઈ, હૈદ્રાબાદ, બેંગલોર, કલકત્તા, ચંદીગઢ અને જયપુર

સમજૂતિ :

P - મંગળવાર - ચંદીગઢ

Q - શનિવાર - ચેન્નાઈ

R - સોમવાર - જયપુર

S - શુક્રવાર - કલકત્તા

T - બુધવાર - હૈદરાબાદ

V - રવિવાર - બેંગલોર

W - ગુરૂવાર - દિલ્હી

236. Q ક્યા દિવસે યાત્રા શરૂ કરે છે ?

A)રવિવાર B)શનિવાર

C)બુધવાર D)માહિતી અપૂરતી છે.

- Q શનિવારના દિવસે યાત્રા કરે છે.

237. બેંગલોર કોણ ગયું છે ?

A)T B)P

C)V D)માહિતી અપૂરતી છે.

- બેંગલોર V જાય છે.

238. T અઠવડિયાના ક્યા દિવસે યાત્રા કરે છે ?

A)મંગળવાર B)ગુરૂવાર C)રવિવાર D)બુધવાર

- T અઠવાડિયાના બુધવારના દિવસે યાત્રા કરે છે.

239. નીચે પૈકી ક્યું વ્યક્તિ-શહેર જૂથ સત્ય નથી ?

A)R - જયપુર B)P - ચંદીગઢ

C)T - હૈદ્રાબાદ D)V - ચેન્નાઈ

- V ચેન્નાઈ (વ્યક્તિ-શહેર)નું જૂથ સત્ય નથી.

240. મંગળવારે કોણે યાત્રા શરૂ કરી છે ?

A)P B)W C)Q D)V


- મંગળવારે Pએ યાત્રા શરૂ કરી છે.

GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017

241. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ ગોઠવો.

AZ, CX, FU, ...

A)<u>JQ</u> B) KP C) IR D) IV



આપેલ મૂળાક્ષરની શ્રેણી વચ્ચે ઉપર મુજબ સંબંધ છે.

242. એક ઘડીયાળમાં મિનીટ દર્શાવતો કાંટો 1 કલાક અને 10 મિનીટ (70 મિનીટ) ફરે છે. આ સંજોગોમાં મિનીટ કાંટો કેટલા અંશ ફરશે?

A)360 B)<u>420</u> C) 480 D) 540

5 મિનિટના ગાળામાં 30°નો ખૂણો બને.

તેથી 70 મિનિટના ગાળામાં (?)

$\frac{70\times30}{5} = 420°$

243. જો SAND = VDQG, BIRD = ELUG, થાય તો LOVE માટે કયો શબ્દ બનશે.


A)PRYG B)ORTC C) NPUH D)<u>ORYH</u>

+3 +3 +3 +3
S A N D
↓ ↓ ↓ ↓
V D Q G

+3 +3 +3 +3
B I R D
↓ ↓ ↓ ↓
E L U G

+3 +3 +3 +3
L O V E
↓ ↓ ↓ ↓
O R Y H

244. નીચેના ચિત્રમાં કેટલા ત્રિકોણ છે?



A)<u>28</u> B)24 C) 20 D) 16

આપેલ ચિત્રમાં



કુલ 8 ત્રિકોણ છે.

જેથી 8 × 3 = 24 + 4 = 28 ત્રિકોણ છે.

245. અરીસામાં અંગ્રેજી કેપીટલ (Capital) અક્ષરો જોવામાં આવે તો કેટલા અક્ષરો સરખા દેખાય છે.

A) 10 B)<u>11</u> C) 12 D) 13

અરીસામાં અંગ્રેજી કેપિટલ અક્ષરો જોવામાં આવે તો '11' અક્ષરો સરખાં દેખાય છે.

A, H, I, M, O, T, U, V, W, X, Y

246. 15 પાણીના પંપ સતત ચાલુ રાખવામાં આવે તો એક ટાંકી 7 દિવસમાં ભરાય છે. જો આ ટાંકી 5 દિવસમાં ભરવાની હોય તો કેટલા વધારના પંપ જોઅએ.

A)21 B)22 C)<u>6</u> D)7

$M_1D_1 = M_2D_2$ — M_1 = 15 પંપ

$15\times7 = (15+x)\times5$ — D_1 = 7 દિવસ

$105 = 75+5x$ — M_2 = 15+X

$105-75 = 5x$ — D_2 = 5 દિવસ

$30 = 5x$

$x = \frac{30}{5}$ $x = 6$ દિવસ

247. X_1, X_2 અને X_3 આંકડાઓની સરેરાશ 14 છે, X_2 અને X_3 નો સરવાળો બમણો કરવામાં આવે તો 30 થાય છે. આ સંજોગોમાં X_1 નું મુલ્ય કેટલું હશે?

A)20 B)<u>27</u> C)16 D)2

$X + X_2 + X_3$ = સંખ્યા × સરેરાશ

= 3 × 14 = 42

હવે, $2(X_2 + X_3) = 30$

$X_2 + X_3 = 30/2 = 15$

તેથી, $X_1 = (X_1+X_2+X_3) - (X_2+X_3)$

= 42 - 15 = 27

248. એક કુટુંબમાં 6 સભ્યો છે અને તેઓની માસિક સરેરાશ આવક રૂ.2000 છે. એક વ્યક્તિના પગારમાં વાર્ષિક 14400નો વધારો થાય છે આ સંજોગોમાં કુટુંબની સરેરાશ આવક વધારા પછી કેટલી હશે?

A)2000 B)2100 C)<u>2200</u> D) 200

વ્યક્તિના પગારમાં વાર્ષિક વધારો = 14400 ₹

માસિક પગાર વધારો $= \frac{14400 ₹}{12} = 1200$ ₹

હવે, આ 1200₹ના માસિક વધારાને કુટુંબના 6 સભ્યોમાં વહેંચતા સરેરાશનો વધારો મળી શકે.

તેથી 1200₹/6 = 200₹ માસિક સરેરાશ આવક વધશે.

કુટુંબની સરે. આવક વધારા પછી = 2000₹ + 200₹ = 2200 ₹

GPSC Class - 2 - 29/1/2017

249. એક શાળામાં ત્રણ વર્ગખંડ છે, જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે. આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20, અને 10 ટકા છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો?

A)<u>$13^1/_3$</u> B) 12.5 C) 15 D) 12

વિદ્યાર્થીની સંખ્યા	40,	50,	60
પાસ થવાથી ટકાવારી	↓10%	↓20%	↓10%
	4	10	6

તેથી, પાસ વિદ્યાર્થીની સંખ્યા = 4 + 10 + 6 = 20

શાળાની પાસ થવાની ટકાવારી $= \frac{20}{150}\times 100 = \frac{40}{3} = 13\frac{1}{3}\%$

250. જો 8 માણસો 24 દિવસમાં 80 હેક્ટરનું ખેડાણ કરી શકે છે, તો 36 માણસો 30 દિવસમાં કેટલા હેક્ટરનું ખેડાણ કરી શકે ?

A) 410 હેક્ટર <u>B) 450 હેક્ટર</u> C) 430 હેક્ટર D) 440 હેક્ટર

$$\frac{M_1D_1}{W_1} = \frac{M_2D_2}{W_2}$$

$$\frac{8\times24}{80} = \frac{36\times30}{W_2}$$

$$W_2 = \frac{36\times30\times80}{8\times24}$$

$W_2 = 450$ હેક્ટર

M_1 = 8 માણસ
D_1 = 24 દિવસ
W_1 = 80 હેક્ટર
M_2 = 36 માણસ
D_2 = 30 દિવસ
W_2 = ? હેક્ટર

251. 5004 ÷ 139 - 6 = ?

A) 24 <u>B) 30</u> C) 36 D) 42

= 5004 ÷ 139 - 6 = 36 - 6 = 30

252. $\frac{4+4\times18-6-8}{123\times6-146\times5} = ?$

A) 1 B) 2 C) 6.65 <u>D) 7.75</u>

$= \frac{4+4\times18-6-8}{123\times6-146\times5} = \frac{4+72-14}{738-730}$

$= \frac{76-14}{8} = \frac{62}{8} = 7.75$

253. 366 પાના ધરાવતી બુકમાં કુલ કેટલી સંખ્યાઓનો ઉપયોગ થયો હશે?

A) 732 B) 1098 <u>C) 990</u> D) 1305

1 થી 9 સંખ્યા = 9 × 1 = 9
10 થી 99 સંખ્યા = 90 × 2 = 180
100 થી 366 સંખ્યા = 267 × 3 = <u>801</u>
કુલ સંખ્યા = 990

254. એક ટાંકીમાં 135 લિટર પાણી ભરેલું છે, જે ટાંકીનો 1/4 ભાગમાં છે. જો ટાંકી માં 180 લિટર પાણી ભરવામાં આવે તો તે ટાંકીનો કેટલામો ભાગ થશે?

A) 1/6 <u>B) 1/3</u> C) 2/3 D) 2/5

135 લિટર ⟶ 1/4 ભાગ
180 લિટર ⟶ ?

$= \frac{180\times1/4}{135} = \frac{180}{135\times4} = \frac{45}{135} = \frac{1}{3}$ ભાગ

255. નવ વ્યક્તિઓ એક હોટલમાં જમવા જાય છે, આ નવ પૈકી આઠ વ્યક્તિઓએ પ્રતિ વ્યક્તિ રૂ.12 પ્રમાણે ખર્ચ કરે છે જ્યારે નવમી વ્યક્તિ નવ વ્યક્તિઓની સરેરાશ રકમ કરતા વધુ આઠ રૂપિયા ખર્ચ કરે છે, તો બધાએ કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કરેલ હશે?

<u>A) 117</u> B) 134 C) 126 D) 164

1 વ્યક્તિનો સરેરાશ ખર્ચ = X ₹
તેથી 9 વ્યક્તિ દ્વારા થયેલ ખર્ચ = 9 × X = 9X ₹
હવે, 8 વ્યક્તિ દ્વારા થયેલો ખર્ચ = 8 × 12₹ = 96 ₹
તથા 9મી વ્યક્તિનો ખર્ચ = X + 8 ₹
તેથી X + 8 + 96 = 9X   8X = 104 ∴ X = 13
તેથી બધાનો કુલ ખર્ચ = 9X = 9×13 = 117₹

256. ડાબી બાજુ આપેલ જોડના તર્કના આધારે જમણી બાજુની જોડ પૂર્ણ કરો.

BDAC : FHEG : : NPMO : ....

A) RQTS B) TRQS C) QTRS <u>D) RTQS</u>

આપેલ મૂળાક્ષરને એકબીજા સાથે નીચે મુજબ સંબંધ છે.



257. જો કોઈ કૂટ ભાષામાં (Coded Language) માં DELHI ને 73541 લખવામાં આવે અને CALUTTA ને 82589662 માં લખવામાં આવે છે, તો એ જ ભાષામાં CALICUT ને કયા રૂપમાં લખવામાં આવે?

A) 5279431 B) 5978013 <u>C) 8251896</u> D) 8543691

D E L H I → 7 3 5 4 1

C A L C U T T A → 8 2 5 8 9 6 6 2

દરેક મૂળાક્ષર તેની સામે આપેલ નંબરને ઉદ્દેશે છે જેથી,

C A L I C U T → 8 2 5 1 8 9 6

258. $(1000)^9 \div 10^{24} = ?$

A) 10,000 <u>B) 1000</u> C) 100 D) 10

$$\frac{(1000)^9}{10^{24}} = \frac{(10^3)^9}{10^{24}} = \frac{10^{27}}{10^{24}} = 10^3 = 1000$$

259. 106 × 106 - 94 × 94 = ?

A) 2004 B) 1904 <u>C) 2400</u> D) 1906

= 106 × 106 - 94 × 94 = $106^2 - 94^2$
= (106 - 94) (106 + 94) $(a^2-b^2 = (a-b)(a+b))$
= 12×200 = **2400**

GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017

260. ત્રણ સળંગ બેકી સંખ્યાઓની સરાસરી 18 છે, તો તે પૈકીની સૌથી મોટી સંખ્યા શોધો.

A) 15 B) 16 <u>C) 20</u> D) 26

3 સળંગ બેકી સંખ્યાઓની સરેરાશ = 18

16   18   20 ← સૌથી મોટી સંખ્યા
 -2   +2

261. જો 30 વ્યક્તિઓ 56 મીટર લાંબી દિવાલ 5 દિવસમાં બનાવી શકતા હોય તો તે જ પ્રકારની દિવાલ 40 વ્યક્તિઓ 3 દિવસમાં કેટલા મીટર લાંબી દિવાલ બનાવી શકે?

A) 36.5 મીટર B) 44.8 મીટર C) 62.3 મીટર D) 92 મીટર

$\frac{M_1D_1}{W_1} = \frac{M_2D_2}{W_2}$ — M_1 = 30 વ્યક્તિ, D_1 = 5 દિવસ

$\frac{30\times5}{56} = \frac{40\times3}{W_2}$ — W_1 = 56 મીટર, M_2 = 40 વ્યક્તિ

$W_2 = \frac{40\times3\times56}{30\times5}$ — D_2 = 3 દિવસ, W_2 = ? મીટર

$W_2 = 44.8$ મીટર

262. 6 : 37, 7 : 50, 8 : 65, 9 : 82, 10 = ...?

A) 96 B) 101 C) 112 D) 109

6 : 37 ($6^2 = 36 + 1$) 7 : 50 ($7^2 = 49 + 1$)

8 : 65 ($8^2 = 64 + 1$) 9 : 82 ($9^2 - 81 + 1$)

10 : 101 ($10^2 - 100 + 1$)

263. AGARTALA સંકેતમાં 14168171 તરીકે લખાય છે, તો AGRA નો સંકેત કયો છે?

A) 1641 B) 1416 C) 1441 D) 1461

A G A R T A L A

↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓

1 4 1 6 8 1 7 1

શબ્દના દરેક મૂળાક્ષર સામે આપેલ નંબરને ઉદ્દેશે છે, જેથી

A G R A

↓ ↓ ↓ ↓


1 4 6 1

264. ક્રમમાં ખોટી સંખ્યા શોધો : 125, 127, 130, 135, 142, 153, 165

A) 130 B) 153 C) 142 D) 165

★ પ્રશ્ન - 265 થી 267

સ્નાતકો, કારકુનો અને સરકારી કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતાં ત્રણ વર્તુળો પરસ્પર છેદન કરે છે. છેદન વિસ્તારો અનુક્રમે A, B, C, e, f, g અને h છે. નીચેના પ્રશ્નોનો જવાબ આપો.



265. કેટલાક સરકારી કર્મચારીઓ છે પરંતુ કારકુનો નથી.

A) h B) g C) f D) e

'f' એ એવા સરકારી કર્મચારીઓ છે જે કારકુનો નથી.

266. કારકુનો કે જેઓ સ્નાતક પણ છે અને સરકારી કર્મચારી પણ છે?

A) e B) f C) g D) h

'h' એ એવા કારકુનો છે જ કે જેઓ સ્નાતક પણ છે અને સરકારી કર્મચારી પણ છે.

267. કેટલાક સ્નાતકો કારકુનો છે. પરંતુ સરકારી કર્મચારીઓ નથી.

A) f B) g C) h D) e

'e' એ એવા સ્નાતકો કારકુનો છે જે સરકારી કર્મચારીઓ નથી.

GPSC Class - 2 - 18/12/2016

પ્રશ્ન ક્રમાક : 268 થી 270 માટે નીચેની સૂચનાઓ ધ્યાન પૂર્વક વાંચીને આપેલા સવાલોના જવાબ આપો:

(i) સાત વિદ્યાર્થીઓ P, Q, R, S, T, U, V એ એક પરીક્ષામાં ભાગ લીધો છે.

(ii) કોઈપણ વિદ્યાર્થીને સરખા માર્ક નથી.

(iii) V ને હંમેશા P થી વધુ માર્ક આવે છે.

(iv) P ને હંમેશા Q થી વધુ માર્ક આવે છે.

(v) દરેક વખતે જયારે R ને સૌથી વધુ માર્ક આવે ત્યારે T ને સૌથી ઓછા માર્ક આવે છે અને જયારે S ને સૌથી વધુ માર્ક આવે છે ત્યારે U અથવા Q ને સૌથી ઓછા માર્ક આવે છે.

268. જો V નો પાંચમો ક્રમ આવ્યો હોય તો નીચેનામાંથી ક્યુ સાચું હશે?

A) S ને સૌથી વધુ માર્ક મળ્યા હશે

B) R નો ક્રમ બીજો હશે

C) T નો ક્રમ ત્રીજો હશે

D) Q નો ક્રમ ચોથો હશે

- જો V નો પાંચમો ક્રમ આવ્યો હોય તો Q ને સૌથી ઓછા માર્ક આવે અને આપેલ માહિતીને આધારે S ને સૌથી વધુ માર્ક આવે.

269. જો R ને સૌથી વધુ માર્ક મળ્યા હોય, તો V નો ક્રમ કયા ક્રમથી નીચે નહીં જ હોય?

A) બીજો B) ત્રીજો C) ચોથો D) પાંચમો

- R V P Q _ _ T

R _ V P Q _ T

R _ _ V P Q T

1 2 3 4 5 6 7

જો R ને સૌથી વધુ માર્ક મળ્યા હોય તો V નો ક્રમ ચોથા ક્રમથી નીચે નહીં જ હોય.

270. જો S નો ક્રમ બીજો હશે, તો નીચેનામાંથી ક્યું સાચું હશે?

A) P ને R કરતાં વધુ માર્ક હશે

B) U ને V કરતાં વધુ માર્ક હશે


C) V ને S કરતાં વધુ માર્ક હશે

D) T ને Q કરતાં વધુ માર્ક હશે

- R V P Q _ _ T

જો S નો ક્રમ બીજો હશે, તો U ને V કરતાં વધુ માર્ક હશે.

271. VAYU8436



A)સાચું જળ પ્રતિબિંબ (1) છે <u>B)સાચું જળ પ્રતિબિંબ (2) છે</u>
C)સાચું જળ પ્રતિબિંબ (3) છે D)સાચું જળ પ્રતિબિંબ (4) છે
આપેલ પ્રશ્નમાનાં તત્ત્વોનું સાચું જળ પ્રતિબિંબ 2 છે.

272. સૂચના : જો નીચે આપેલ 'X' પારદર્શક કાગળને જો આપેલ ડોટેડ લાઈન પ્રમાણે ગેડ પાડીને વાળવામાં આવે તો પેના પર દોરેલ ચિત્ર નીચે (1) થી (4) પૈકી કેવું દેખાય?

(X) (1) (2) (3) (4)

A)ઉપરોક્ત પૈકી (1) સાચું છે.
B)ઉપરોક્ત પૈકી (2) સાચું છે.
<u>C)ઉપરોક્ત પૈકી (3) સાચું છે.</u>
D)ઉપરોક્ત પૈકી (4) સાચું છે.
જો આપેલ 'X' પારદર્શક કાગળને જો આપેલ ડોટેડ લાઈન પ્રમાણે ગેડ પાડીને વાળવામાં આવે તો વિકલ્પ 3 (અરીસામાં પ્રતિબિંબ) પ્રમાણે ચિત્ર દેખાય.

273. સૂચના નીચે આપેલ આકૃતિમાં નાના-મોટા કુલ કેટલા ચોરસ છે?



A)26 B)28 <u>C)30</u> D)31
આપેલ આકૃતિમાં ચોરસના બરાબરના 16 ખાના છે. જેના આધારે નાના-મોટા કુલ 30 ચોરસ છે.


GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017

274. ACFJ નો કોડ ZXUQ હોય તો EGJN નો કોડ કયો હશે?
A)UWTS <u>B)VTQM</u> C)WZMN D)QRXZ


A C F J E G J N
↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓
Z X U Q V T Q M

આપેલ શબ્દના દરેક મૂળાક્ષરને સામે આપેલ મૂળાક્ષર સાથે એકબીજાના વિરુદ્ધ મૂળાક્ષરનો સંબંધ છે.

275. CXDW, EVFU, GTHS, IRJQ,..........?
A)KPLG B)KQHF C)KRNJ <u>D)KPLO</u>



276. HV, GT, FR, EP, DN,.........?
A)LM B)NO <u>C)CL</u> D)KL



GPSC Class - 2 - 12/2/2017

277. 45 વિદ્યાર્થીઓના વર્ગમાં મહેશ 20માં નંબરે પાસ થાય છે. જો વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો તેનો નંબર 1 નંબર પાછળ આવે છે. આં સંજોગોમાં છેલ્લેથી મહેશને કેટલામો નંબર હશે.
A)25 B)26 <u>C)27</u> D)28
45 વિદ્યાર્થીઓના વર્ગમાં મહેશ 20માં નંબરે પાસ થાય છે. જો વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો તેનો નંબર 21મો થાય. આ સંજોગોમાં છેલ્લેથી મહેશનો નંબર (47-21 = 26 + 1 = 27) 27 હશે.

278. ખાલી જગ્યા પુરો.

3	8	10	16
6	(56)	90	(?)

A)256 <u>B)240</u> C)272 D)288
$3^2 = 9 - 3 = 6$ $8^2 = 64 - 8 = 56$
$10^2 = 100 - 10 = 90$ $16^2 = 256 - 16 = \underline{240}$

279. ખાલી જગ્યા પુરો.
7,...... 21, 31, 43
A)11 <u>B)13</u> C)15 D)17

280. ટેલિવિઝન સેટની કિંમતમાં 25% વધારો થાય છે. બજારમાં માંગને ટકાવી રાખવા કેટલા ટકા વળતર આપવું જરૂરી છે. જેથી મુળ કિંમતે ટેલિવિઝન સેટ વહેંચી શકાય?
A)15 <u>B)20</u> C)25 D)30
મૂ.કિ. = 100 ₹ (25% વધારો)
વે.કિ./MRP = 125 ₹

$$\text{હવે, \% વળતર} = \frac{\text{વળતર}}{MRP} \times 100 = \frac{25}{125} \times 100$$

$$= \frac{1}{5} \times 100 = 20\%$$

281. 20 સરખી ક્ષમતા વાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના પંપની જરૂરીયાત છે?
A)30 B)20 <u>C)10</u> D)40
$M_1 \times D_1 = M_2 \times D_2$ $M_1 = 20$ પંપ
$20 \times 6 = (20 + x) \times 4$ $D_1 = 6$ દિવસ
$30 = 20 + x$ $M_2 = 20 + X$ વ્યક્તિ
$x = 10$ પંપ $D_2 = 4$ દિવસ

282. 30 સેમી × 30 સેમી × 5 સેમી વિસ્તાર ધરાવતી મોટી કેકમાંથી 5 સેમી × 5 સેમી × 10 સેમી ની કેટલી કેક બની શકે?

A) 10 B) 15 C) 18 D) 30

નાની કેકની સંખ્યા $= \frac{\text{મોટી કેકનું ઘનફળ}}{\text{1 નાની કેકનું ઘનફળ}}$

$= \frac{30\text{સેમી} \times 30\text{સેમી} \times 5\text{સેમી}}{5\text{સેમી} \times 5\text{સેમી} \times 10\text{સેમી}} = \frac{36}{2} = 18$

283. એક સમુહમાં 10 વ્યકિતઓ છે તેઓ એક બીજા સાથે મહત્તમ કેટલી વખત હાથ મેળવી શકશે?

A) 20 B) 25 C) 40 D) 45

10 વ્યક્તિઓમાંથી એકબીજાને હાથ મેળવી ત્યારે 2 વ્યક્તિ તેમાં સંકળાયેલ ગણી શકાય.

તેથી હાથ મેળવી શકવાની સંખ્યા = $^{10}C_2 = 10 \times 9/2 =$ **45**

284. 'અ' અને 'બ' શહેર એક બીજાની વિરૂધ્ધ દિશામાં આવેલ છે. અને તેમનું અંતર 360 કિલોમીટર છે. જતી વખતે વાહનની સરેરાશ ઝડપ 40 કિ.મી./દર કલાક અને આવતી વખતે 60 કિ.મી./દર કલાક રહે છે.

આ સંજોગોમાં સંપૂર્ણ પ્રવાસની સરેરાશ ઝડપ કેટલી હશે?

A) 45 કિ.મી./દર કલાક B) 48 કિ.મી./દર કલાક

C) 50 કિ.મી./દર કલાક D) 55 કિ.મી./દર કલાક

40 કિ/ક.=X 60 કિ/ક.=Y

બંને શહેર વચ્ચે સરખું અંતર = 360 કિ.મી.

∴ સરેરાશ ઝડપ $= \frac{2xy}{x+y} = \frac{2 \times 40 \times 60}{40+60}$

$= \frac{2 \times 40 \times 60}{100} = 48$ કિ/ક

GPSC Class - 2 - 28/1/2017

285. ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે?

84	
14	12

81	
18	9

88	
	11

A) 7 B) 16 C) 21 D) 28

- $12 \times 7 = 84$ $7 \times 2 = 14$
- $9 \times 9 = 81$ $9 \times 2 = 18$
- $11 \times 8 = 88$ $8 \times 2 = 16$

286. ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે?

29	13	18
33		19
30	27	3

A) 19 B) 15 C) 11 D) 8

29 + 13 + 18 = 60

30 + 8 + 19 = 60

30 + 27 + 3 = 60

287. પાંચ જણાનાં કુટુંબની સરેરાશ માસિક આવક રૂા. 1000 છે. એક સભ્યની વાર્ષિક આવકમાં રૂા.12000નો વધારો થાય તો વધારા બાદ કુટુંબનાં દરેક સભ્યની માસિક સરેરાશ આવક કેટલી થશે?

A) 1600 B) 1200 C) 2000 D) 3400

વાર્ષિક આવકમાં વધારો = 12000 ₹

તેથી માસિક આવકમાં વધારો $= \frac{12000 ₹}{12}$

= 1000 ₹

આ 1000₹ ના વધારાને દરેક સભ્યમાં વહેચતાં,

$= \frac{1000₹}{5 \text{ સભ્યો}} = 200₹$

તેથી દરેક સભ્યની માસિક સરેરાશ આવક = 1000₹ + 200₹

= 1200₹

288. અરૂણ પોતાનાં વાહનની પેટ્રોલ ટેન્ક પૂર્ણ રીતે ભરાવે છે ત્યારે 10 દિવસ પેટ્રોલ ચાલે છે. જો તે પોતાનો રોજના વાહનનો ઉપયોગ 25% વધારે તો વાહન હવે કેટલાં દિવસ ચાલશે?

A) 5 B) 6 C) 7 D) 8

$M_1 = 1$ ઉપયોગ

$D_1 = 10$ દિવસ

$M_2 = 1 \times 125/100$

$= 1.25$

$D_2 = ?$ દિવસ

$M_1D_1 = M_2D_2$

$1 \times 10 = 1.25 \times D_2$

$D_2 = \frac{10}{1.25} = \frac{1000}{125} = 8$ દિવસ

289. એક કંપનીનાં 100 કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર 16000 રૂા. છે નવા વર્ષમાં 5% પગાર વધારો આપવામાં આવે છે પરંતુ દરેકને ચુકવવા પાત્ર વાહન ભથ્થુ રૂા. 800 બંધ કરવામાં આવે છે આ સંજોગોમાં નવો માસિક સરેરાશ પગાર કેટલો હશે?

A) 16500 B) 16800 C) 16000 D) 15200

સરેરાશ માસિક પગાર = 16000₹

સરેરાશમાં 5% પગાર વધારો કરતાં,

= 16000×5/100 = 800₹

હવે, જે પગાર વધવાનો છે તેટલો જ વાહન ભથ્થાં લેખે 800₹ બંધ કરવામાં આવે છે. આથી પગારમાં કોઈ ફેરફાર થશે નહીં.

તેથી નવો માસિક સરેરાશ પગાર = 16000₹

GPSC Class-1 - 15/01/2017

290. જો 841 = 3, 633=5 અને 425=7 તો 217 = ?

A) 6 B) 7 C) 8 D) 9

841 = 3 (8 ÷ 4 = 2 + 1 = 3)

633 = 5 (6 ÷ 3 = 2 + 3 = 5)

425 = 7 (4 ÷ 2 = 2 + 5 = 7)

217 = 9 (2 ÷ 1 = 2 + 7 = 9)

291. એક વ્યકિતના પગારમાં 40% નો વધારો થાય છે અને પછી 20% નો ઘટાડો થાય છે તો તેનો પગાર કેટલા ટકા થયો?

A) 60 % B) 40 % C) 20 % D) 12%

$X = +40\%,\quad Y = -20\%$

$\% \text{ ફેરફાર} = X + Y + \frac{XY}{100} = 40 - 20 + \frac{40 \times -20}{100}$

$= +20 - 8 \quad = +12\%$

આથી પગાર 12% થયો ગણાય.

292. બે આંકડાની એક સંખ્યા કે જેનો સરવાળો 7 થાય છે બંને આંકડાને અરસપરસ બદલાવાથી તે અંકમાં 27 વધે છે, તો તે સંખ્યા કઈ હશે?

A) 35 B) 25 C) 52 D) 23

વિકલ્પ B અને Cના અંકોનો સરવાળો 7 થાય છે.

અંક બદલતા

વિકલ્પ B ⟶ 25 ⟶ 52

$\therefore 52 - 25 = 27$ વધારો

અંક બદલતા

વિકલ્પ C ⟶ 52 ⟶ 25

$\therefore 52 - 25 = 27$ ઘટાડો

$\therefore$ અહીં, 27 જે વધારો હોવાથી તે સંખ્યા = 25

293. ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખુ અંતર કાપવા માટે નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયા ગુણોત્તર મુજબ સમય લાગશે?

A) 2 : 3 : 4 B) 4 : 3 : 2 C) 4 : 3 : 6 D) 6 : 4 : 3

ઝડપ ⟶ 2 : 3 : 4

ઝડપ (વ્યસ્ત પ્રમાણ) ⟶ $\frac{1}{2} : \frac{1}{3} : \frac{1}{4}$


લ.સા.અ. (2, 3, 4) = 12

$\therefore \frac{1\times6}{2\times6} : \frac{1\times4}{3\times4} : \frac{1\times3}{4\times3} \quad \therefore \frac{6}{12} : \frac{4}{12} : \frac{3}{12}$

$\therefore 6 : 4 : 3$

294. 30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દૂધ અને પાણીનો રેશિયો 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું પડે?

A) 30 B) 33 C) 32 D) 35



GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017

295. બસમાં મુસાફરી કરતો એક મુસાફર રૂા.1100 ચૂકવી અમદાવાદ થી આણંદની 5 અને અમદાવાદ થી વડોદરાની 10 ટિકીટો ખરીદે છે. જો અમદાવાદ થી આણંદ અને અમદાવાદ થી વડોદરાની એક-એક ટિકીટનું કુલ મૂલ્ય રૂા.140 હોય તો અમદાવાદથી આણંદની એક ટિકીટનું મૂલ્ય કેટલું હશે ?

A) રૂા.60 B) રૂા.80 C) રૂા.50 D) રૂા.70

ધારો કે,

અમદાવાદથી આણંદની ટિકિટનું મૂલ્ય = X₹

અમદાવાદથી વડોદરાની ટિકિટનું મૂલ્ય = Y₹

$\therefore 5X + 10Y = 1100$ 1

$X + Y = 140$ 2

સમી 2 ને 10 વડે ગુણી લોપની પદ્ધતિથી,

$\therefore 5X + 10Y = 1100$

$10X + 10Y = 1400$

$-5X = -300 \qquad 5X = 300 \qquad X = 60$₹

296. બે અંકોની એક સંખ્યા શોધો જેને દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો હોય અને સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 54 જેટલી નાની હોય.

A) 18 B) 93 C) 37 D) 72

આવા દાખલાઓ વિકલ્પ પરથી જ સરળતાથી ઉકેલી શકાય. માત્ર વિકલ્પ B 93 માં જ દશકનો અંક એકમથી 3 ગણો છે.

297. $^{18}/_{5^3}$ ને દશાંશ ચિન્હ પછી કેટલા અંકો છે.

A) 4 B) 3 C) 2 D) 1

$\frac{18}{5^3} = \frac{18}{125} = 0.144$

અહીં, 0.144માં દશાંશ ચિહ્ન પછી 3 અંકો આવશે.

298. 2cm ત્રિજ્યા અને 6cm લંબાઈ ધરાવતા લોખંડના એક સળીયાને ઓગાળીને 24 સેમી લંબાઈ ધરાવતો તાર બનાવવામાં આવે છે. તો આ તારનું ઘનફળ સળીયાનાં ઘનફળ કરતા કેટલા ગણું વધારે હશે ?

A) ચાર ગણું B) ત્રણ ગણું

C) બે ગણું D) ઘનફળ સરખું રહેશે.

અહીં, લોખંડના સળીયાને ઓગાળીને, તેમાંથી તાર બનાવવામાં આવે છે, આથી તાર અને સળીયો બન્નેનું ઘનફળ સરખું જ રહેશે. માત્ર તેના આકારમાં ફેરફાર થાય છે.

299. 1, 2, 5, 10, 17, ...

A) 20 B) 22 C) 24 D) 26

GPSC Class - 2 - 16/04/2017

300. એક વેપારી રૂા.18,700માં વસ્તુ વેચે છે તો તેને 15% નુકશાન થાય છે જો 15 % નફો જોઈતો હોય તો કેટલા રૂા. માં વસ્તુ વેચવી જોઈએ?

A)22,000 B)<u>25,300</u> C)21,000 D)28,000

વે.કિ.

15% નુકસાન = મૂ.કિ.ના 85%

15% નફો = મૂ.કિ.ના 115%

વે.કિ.

85% ⟶ 18700 $= \frac{115 \times 18700}{85} = 25300$ ₹

115% ⟶ ?

301. 1 થી 70માં 1 અને 9 એકમમાં હોય, તેવી સંખ્યા કુલ સંખ્યાનાં કેટલા ટકા છે?

A)14 B)<u>20</u> C)70 D)15

1 થી 70 માં,

1 એકમમાં હોય તેવી સંખ્યા,

= 1, 11, 21, 31, 41, 51, 61 = 7 સંખ્યા

9 એકમમાં હોય તેવી સંખ્યા,

= 9, 19, 29, 39, 49, 59, 69 = 7 સંખ્યા

કુલ સંખ્યા = 7 + 7 = 14

∴% સંખ્યા $= \frac{14}{70} \times 100$ = 20%

302. આજે બુધવાર છે 85 દિવસ બાદ કયો વાર આવશે?

A)બુધવાર B)<u>ગુરુવાર</u> C)શુક્રવાર D)મંગળવાર

જો આજે બુધવાર હોય તો 85 દિવસ બાદ ગુરુવાર આવે.

303. એક ક્રિકેટની મેચમાં પ્રથમ દસ ઓવરની સરેરાશ 3.6 રન છે, જો કુલ 148 રન બનાવવાના હોય તો પછીની 10 ઓવરમાં સરેરાશ કેટલા રન જરૂરી છે?

A)14.8 B)7.4 C)<u>11.2</u> D)3.6

પ્રથમ 10 ઓવરમાં રન = ઓવર × સરેરાશ

= 10 × 3.6 = 36 રન

હજુ બાકી રન = 148 – 36 = 112 રન

પછીની 10 ઓવરમાં સરેરાશ $= \frac{\text{જરૂરી રન}}{\text{ઓવર}} = \frac{112}{10} = 11.2$ રન

304. 298×298 (298 ગુણ્યા 298) કેટલા થાય?

A)91,204 B)91,196 C)88,084 D)<u>88,804</u>

= 298 × 298 = (300-2) (300-2) = $(300-2)^2$

હવે, $(a-b)^2 = a^2 - 2ab + b^2$

$= 300^2 - 2 \times 300 \times 2 + 2^2$

= 90000 - 1200 + 4 = 88800 + 4 = 88,804

305. એક ધંધામાં નફા-ફાળવણીનું પ્રમાણ 5 : 2 : 4 : 3 અનુક્રમે 'અ','બ','ક', અને 'ડ' માટે છે જો 'ક' ને 'ડ' કરતા 2000 રૂા. વધુ મળે તો 'બ' ને કેટલા રૂા. મળશે?

A)10,000 B)8,000 C)6,000 D)<u>4,000</u>

અ : બ : ક : ડ

↓ ↓ ↓ ↓

5 : 2 : 4 : 3 ⟵ 1નો તફાવત

1 યુનિટનો તફાવત = 2000₹ $= \frac{2 \times 2000}{1} = 4000$ ₹

∴ 'બ'ના 2 યુનિટ = ?

306. નીચેના પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી?

6, 9, 15, 21, 24, 28, 30

A)15 B)<u>28</u> C)24 D)30

GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017

307. $(-8)^9 + (-8)^3 + (-8)^4 =$

A)<u>+ 64</u> B)- 64 C)- 128 D)+ 128

$= (-8)^9 + (-8)^3 + (-8)^4 = (-8)^9 \times \frac{1}{(-8)^3} \times \frac{1}{(-8)^4}$

$= \frac{(-8)^9}{(-8)^{3+4}} = \frac{(-8)^9}{(-8)^7} = (-8)^{9-7} = (-8)^2 = 64$

308. 5:4નો ગુણોત્તર ટકાવારીમાં એકસરખો કઈ રીતે દર્શાવાય ?

A)12% B)40% C)80% D)<u>125%</u>

5 : 4 = 5/4

ગુણોત્તરની ટકાવારી = 5/4 × 100 = 125%

GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017

309. અ, બ અને કની ઉંમરનો સરવાળો 90 વર્ષ છે, ત્રણ વર્ષ પહેલા તેઓની ઉંમરનો સરવાળો કેટલો હશે ?

A)93 B)87 C)<u>81</u> D)78

અ+બ+કની ઉંમરનો સરવાળો = 90 વર્ષ

ત્રણ વર્ષ પહેલા સરવાળો = 90 - (3×3 વર્ષ)

(કેમકે ત્રણેયમાંથી 3 ઘટશે)

= 90 - 9 = 81 વર્ષ

310. 1056માં નીચેના પૈકી કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો 23 વડે ભાગી શકાય ?

A)<u>2</u> B)3 C)18 D)21

23)1056(45
 95
 136
 115
 21

અહીં, 1056ને 23 વડે ભાગતાં શેષ 21 વધે છે.

આથી, શેષને શૂન્ય બનાવવા માટે, 23-21 = 2 ઉમેરવા પડે.

311. $\frac{(2.39)^2 - (1.61)^2}{2.39 - 1.61}$

A)2 B)3 C)<u>4</u> D)1.78

$\frac{(2.39)^2 - (1.61)^2}{2.39 - 1.61}$ 2.39 = a અને 1.61 = b લેતાં.

$= \frac{a^2 - b^2}{a - b} = \frac{(a-b)(a+b)}{a-b} = a + b = 2.39 + 1.61 = 4$

312. એક પ્રવાહીમાં A અને Bનું ગુણોત્તર 2:1 છે અને કુલ પ્રવાહી 60 લીટર છે. જો A અને Bનું ગુણોત્તર 1:2નું રાખવામાં આવે તો Bનો જથ્થો કેટલાં લીટર વધારવો પડે ? (મુળ ગણત્રી મુજબનો Aનો જથ્થો યથાવત રાખવાનો છે)

A)20 B)30 C)40 D)60

1 ભાગ = 60/3 = 20 લિટર

60 લિટર ⟶ A : B

2 : 1 = 3 ભાગ

↓×20 ↓×20

40 : 20 લિ.

$A \longrightarrow \frac{40}{20+X} = \frac{1}{2}$ ← B

80 = 20 + X

80 - 20 = X X = 60 લિ.

313. 1, 4, 27, 256, ...ખાલી જગ્યા પુરો.

A)525 B)625 C)725 D)825

314. રમણ એક બેંકમાં 12500 રૂ.નં રોકાણ કરે છે અને તેને 15,500 રૂ.4 વર્ષ બાદ પરત મળે છે. આ સંજોગોમાં તેને ક્યા દરે સાદુવ્યાજ મળેલ હશે ?

A)5 % B)6 % C)7 % D)8 %

સાદું વ્યાજ = $\frac{P \times R \times N}{100}$

P = 12500 ₹

P^1 = 15500 ₹

સા.વ્યા. = P - P^1

= 15500-12500

= 3000₹

N = 4 વર્ષ

R = ?

$3000 = \frac{12500 \times R \times 4}{100}$

$R = \frac{3000 \times 100}{12500 \times 4}$

$R = \frac{3000}{500} = 6\%$

315. એક વ્યક્તિ 1400 રૂ.માં ટેબલ ખરીદે છે અને 15% ખોટ ખાઈને તે વેચી નાખે છે. આ સંજોગોમાં તેને કેટલા રૂપિયા મળ્યા હશે ?

A)1610 B)1400 C)1190 D)1625

મૂ.કિ. = 1400₹ % ખોટ = 15%

વે.કિ. = $\frac{100 - \%\text{ખોટ}}{100}$ × મૂ.કિ.

$= \frac{100-15}{100} \times 1400 = \frac{85}{100} \times 1400 = 1190$₹

316. 66 ઘન (ક્યુબીક) સેન્ટીમીટરના ચાંદીના જથ્થાને 1 મીલીમીટર ત્રિજ્યા ધરાવતાં વાયરમાં તબ્દીલ કરવામાં આવે તો તેની લંબાઈ કેટલી હશે ?

A)21 મીટર B)42 મીટર C)84 મીટર D)12 મીટર

સમઘનનું ઘનફળ = નળાકારનું ઘનફળ (તાર)

66 સેમી^{3} = $\pi r^2 h$

$66 = \frac{22}{7} \times \frac{1}{10} \times \frac{1}{10} \times h$ (∴1 મિ.મિ = 1/10 સે.મી.)

$\frac{66 \times 7 \times 100}{22} = h$ h = 2100 સે.મી.

આથી તારની લંબાઈ h = 2100 સે.મી = 21 મીટર

317. આજે સોમવાર છે તો 61 દિવસ બાદ ક્યો વાર હશે ?

A)શનિવાર B)બુધવાર C)મંગળવાર D)સોમવાર

જો આજે સોમવાર હોય તો 61 દિવસ બાદ શનિવાર આવે.

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017

318. 4 : 15, 5 : 26, 6 : 35, 7 : ....?

A)48 B)47 C)50 D)51

4 : 15 (4 × 4 = 16 - 1) 5 : 26 (5 × 5 = 25 + 1)

6 : 35 (6 × 6 = 36 - 1) 7 : 50 (7 × 7 = 49 + 1)

319. જો 5 × 3 = 925 અને 6 × 7 = 4936 હોય તો 9 × 8 =.........?

A)8164 B)6481 C)7272 D)2727


5 × 3 = 9 25 (3^2 =9; 5^2 = 25)

6 × 7 = 49 36 (7^2 =49; 6^2 = 36)

9 × 8 = 64 81 (8^2 =64; 9^2 = 81)

320. A, B અને C નો માતા છે, D, C નો પતિ છે, તો A, D ના શું થશે?

A)જમાઈ B)માતા C)સાસુ D)સસરા



ઉપરની આકૃતિને આધારે કહી શકાય કે A, Dના સાસુ થશે.


321. જો ગઈકાલના આગલા દિવસે ગુરૂવાર હોય તો રવિવાર કયારે થશે?

A)આજે B)પરમ દિવસે C)ગઈકાલે D)કાલે

જો ગઈકાલના આગલા દિવસે ગુરૂવાર હોય તો રવિવાર કાલે થશે.

322. JAZ, LEX, NIV, PMT, ...?

A)RUS B)QUR C)SUR D)ROR



323. બાવન પત્તામાંથી એક પત્તુ યદેચ્છ રીતે ખેંચવામાં આવે છે. આ પાનું ચિત્રનું પાનું (રાજા, રાણી, અથવા ગુલામ) હોવાની સંભાવના કેટલી?

A)1/13 B)2/13 C)3/13 D)4/13

52 પત્તામાંથી ચિત્રવાળા પત્તાની સંખ્યા = 3×4 = 12 પત્તા

આથી, ચિત્રનું પાનું હોવાની સંભાવના = 12/52 = 3/13

324. એક વ્યકિતને એક વસ્તુનું રૂ.480 માં વેચાણ કરતાં 20% નુકશાન જાય છે. જો તેણે 20% નફો કરવો હોય તો તે વસ્તુનું કઈ કિંમતે વેચાણ કરશે?

A)600 B)700 C)620 D)720

વે. કિ.

20% નુકસાન = 80% મૂ.કિ.ના

20% નફો = 120% મૂ.કિ.ના

80% મૂ.કિ. = 480ર $= \frac{120 \times 480}{80}$ = 720 ર

120% મૂ.કિં. = ?

325. 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિઃશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7માં ક્રમે કઈ સંખ્યા હશે.

A)56 B)64 C)68 D)60

4થી 84 વચ્ચે સંખ્યાની ગણતરીમાં

4 અથવા 84 ને ગણી શકાય નહીં

હવે, સંખ્યાને વધારેથી ઓછી ગોઠવતાં 7મા ક્રમે સંખ્યા

= 80, 76, 72, 68, 64, 60, **56**

GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017

326. જો HEAVY નો કોડ ICBTZ હોય તો QUICK નો કોડ શું હશે?

A)OSJAL B) QRJAL

C)RSJBL D)ઉપરના પૈકી કોઈ નહીં

+1 -2 +1 -2 +1

H E A V Y

↓ ↓ ↓ ↓ ↓

I C B T Z

+1 -2 +1 -2 +1

Q U I C K

↓ ↓ ↓ ↓ ↓

R S J A L

327. જો C × Q = 51, F × S = 114, અને S × C = 57, હોય, તો Q × F = ?

A)96 B)78 C)102 D)114

(3×17) C×Q = 51,

(6×19) F×S = 114,

(19×3) S×C = 57,

(17×6) Q×F = 102

328. જો ધાન્ય : ખેતર હોય, તો નીચેના પૈકી ક્યું સાચું છે?

A)દર્દી : દવાખાનું B)બાળકો : શાળા

C)લોખંડ : કારખાનું D)ફિલ્મ : દ્રશ્ય


ધાન્ય : ખેતર

લોખંડ : કારખાનું

જેમ ધાન્ય (પાકા માલ તરીકે) ખેતરમાંથી મળે છે. તેમ લોખંડ (પાકા માલ તરીકે) કારખાનામાંથી મળે છે.

329. છ વ્યકિતઓ A, B, C, D, E અને F વર્તુળાકાર ઊભાં છે. D અને C ની વચ્ચે B છે. E અને C ની વચ્ચે A છે. D ની જમણે F છે. A અને F ની વચ્ચે કોણ છે?

A)B B)E C)C D)F



A અને Fની વચ્ચે 'E' છે.

330. B, D, G, I, L, N,...?...

A)O B)Q C)S D)U

+2 +3 +2 +3 +2 +3

B—D—G—I—L—N—Q

331. X, U, S, P, N, K, I, ...?...

A)F B)J C)M D)K

-3 -2 -3 -2 -3 -2 -3

X—U—S—P—N—K—I—F

332. 3, 7, 15, 31, 63, ...?...

A)67 B)83 C)127 D)126

333. જો પહેલી ઓક્ટોબર રવિવાર હોય તો પહેલી નવેમ્બર કયો વાર હશે?

A)સોમવાર B)મંગળવાર C)ગુરુવાર D)બુધવાર

જો પહેલી ઓક્ટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે બુધવાર હશે.

334. 46 વિદ્યાર્થીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ 12મો હોય તો છેલ્લેથી તેનો ક્રમ કયો થશે?

A)33 B)34 C)35 D)36

46 વિદ્યાર્થીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ 12મો હોય તો છેલ્લેથી તેનો ક્રમ 35 (46-12 = 34 + 1 = 35) થશે.

335. હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે, જો તેની વસ્તી દર વર્ષે 10 ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે?

A)2,07,800 B)2,17,800 C)2,27,800 D)2,23,800

હાલની વસતી → 1,80,000

↓10% (+18,000)

1 વર્ષ → 1,98,000

↓+10% (+19,800)

2 વર્ષ → 2,17,800

336. એક કાર એક સેકંડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ કિલોમીટર/ કલાક ના દરે શું હશે?

A)40 કિ.મી B)32 કિ.મી C)48 કિ.મી D)36 કિ.મી

ઝડપ = $\frac{\text{અંતર}}{\text{સમય}} = \frac{10 \text{ મીટર}}{1 \text{ સેકન્ડ}}$ = 10 મી/સે.

10 મી/સે. = 10×18/5 કિ/ક = 36 કિ.મી./કલાક

337. 3 : 25, 4 :34, 5 : 43, 6 : 52, 7 : ?

A) 42 B) 44 C) 59 D) 61

3 : 25 $(3 \times 8 = 24 + 1)$

4 : 34 $(4 \times 8 = 32 + 2)$

5 : 43 $(5 \times 8 = 40 + 3)$


6 : 52 $(6 \times 8 = 48 + 4)$

7 : 61 $(7 \times 8 = 56 + 5)$

GPSC Class - 2 - 18/03/2017


338. ખાલી જગ્યા પુરો : AZ, BX, CU........

A) DP B) DR C) DQ D) DO



339. સાંકેતીક ભાષામાં MADE ને NZWV તરીકે લખવામાં આવે છે તો BACK ને કઈ રીતે લખવામાં આવશે?

A) XZWO B) YZXP C) NRJU D) STZU



340. ખાલી જગ્યા પૂરો.

3	380	7
2	224	6
1	720	?

A) 5 B) 8 C) 9 D) 11

341.

64			40			?	
16	8		24	5		36	8

ખાલી જગ્યા પુરો :

A) 72 B) 96 C) 144 D) 36

- $8 \times 8 = 64$ $8 \times 2 = 16$
- $5 \times 8 = 40$ $8 \times 3 = 24$
- $8 \times 9 = 72$ $9 \times 4 = 36$

342. પાંચ વ્યક્તિઓ ધરાવતા કુટુંબની માસિક સરેરાશ આવક 12,000 રૂા. છે, પાંચ વ્યક્તિઓ પૈકી એકના માસિક પગારમાં રૂા. 12,000 નો વધારો થાય છે આ સંજોગોમાં પાંચ વ્યક્તિઓ ધરાવતા કુટુંબની માસિક સરેરાશ આવક કેટલી હશે?

A) 12,000 B) 24,000 C) 22,000 D) 14,400

એક વ્યક્તિની માસિક પગારમાં વધારો = 12000₹

આથી હવે, કુટુંબની સરેરાશ આવકમાં વધારો = $\frac{12000}{5}$

= 2400 ₹

∴ નવી માસિક આવક = 12000 + 2400₹ = 14400 ₹

343. કામ મોડુ કરવાં બદલ કામદારોને પ્રથમ દિવસે 200 રૂા. બીજા દિવસે 250 રૂા. ત્રીજા દિવસે 300 રૂા. એમ દરરોજની રકમ 50 રૂા. વધારીને પેનલ્ટી વસુલ કરવાની શરત છે. જો કામ 10 દિવસ મોડુ થાય તો કુલ દંડ કેટલો થશે?

A) 4,450 B) 4,250 C) 4,050 D) 3,950

GPSC Class - 1 - 28/01/2017

344. 3125 + 125 - 3150 + 225 નો જવાબ કેટલો થશે?

A) 17 B) 11 C) 19 D) 14

$= 3125 \div 125 - 3150 \div 225$

$= \frac{3125}{125} - \frac{3150}{225} = 25 - 14 = 11$

345. એક વાહન 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. આ સંજોગોમાં મૂળ ગતિ કરતા કેટલા કિ.મી. પ્રતિ કલાકની ઝડપ વધારવી પડશે?

A) 90 B) 45 C) 30 D) 180

	જવામાં	પરત વખતે
સમય ⟶	3 કલાક	: 2 કલાક
ઝડપ ⟶ (વ્યસ્ત પ્રમાણ)	2	: 3
	↓×30	↓×30
	60 કિ/ક	90 કિ/ક

30 કિ/ક.

ઝડપ વધારવી પડે.

346. 3 + 33 + 3.33 + 333.333 = કેટલા થાય?

A) 372.663 B) 372.63 C) 37.2663 D) 3723.63

$$\begin{array}{r} 3 \\ +\ 33 \\ +\ 3.33 \\ +\ 333.333 \\ \hline 372.663 \end{array}$$

347. નીચેના વિકલ્પો પૈકી કયો ક્રમ તાર્કિક ગોઠવણી દર્શાવે છે?

(1) મહારાષ્ટ્ર (2) વિશ્વ (3) મુંબઈ (4) ભારત (5) એશિયા

A) 1 5 3 2 4 B) 3 1 4 5 2 C) 3 4 2 1 5 D) 3 2 1 5 4

તાર્કિક ગોઠવણી :

3) મુંબઈ 1) મહારાષ્ટ્ર 4) ભારત 5) એશિયા 2) વિશ્વ

નાયબ ચિટનીશ - 05/02/2017

348. 5, 10, 16, 23, 31, ...ક્રમમાં આગળ કઈ સંખ્યા આવે ?

A) 39 B) 38 C) 41 D) 40

349. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

A) ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે.

B) પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.

C) પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.

D) ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે.

કેમ કે પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે નૈઋત્ય દિશા આવે.

350. ₹ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

A) 75 પૈસા B) 1 રૂપિયો

C) 1 રૂપિયો 50 પૈસા D) 1 રૂપિયો 25 પૈસા

25₹ ના 4% = ?

$25 \times \frac{4}{100} = 1$ ₹

GPSC Class - 2 - 16/04/2017

351. રમણ 12% ના સાદા વ્યાજે લોન લે છે. ત્રણ વર્ષ બાદ વ્યાજ પેટે 5400 રૂા. ચૂકવે છે. આ સંજોગોમાં મુદલ રકમ કેટલી હશે?

A) 10,000 B) 12,000 C) 15,000 D) 18,000

સાદું વ્યાજ = $\frac{P \times R \times N}{100}$ P = ? R = 12% N = 3 વર્ષ સા.વ્યા. = 5400₹

$5400 = \frac{P \times 12 \times 3}{100}$

$P = \frac{5400 \times 100}{12 \times 3}$

P = 15000 ₹

352. આજે સોમવાર છે. 61 દિવસ બાદ કયો વાર હશે?

A) બુધવાર B) ગુરૂવાર C) શુક્રવાર D) શનિવાર

જો આજે સોમવાર છે તો 61 દિવસ બાદ શનિવાર હશે.

353. 668માં ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી નવી સંખ્યા ને 29 વડે ભાગી શકાય?

A) 26 B) 27 C) 28 D) 25

29)668(23
58
88
87
1 ← શેષ

અહીં, શેષ 1 હોવાથી, 668ને 29 વડે ભાગી શકવા માટે જરૂરી સંખ્યા = 29 - 1 = 28

354. $144 \times (5)^4$ = ...

A) 9,000 B) 90,000 C) 900 D) 9,00,000

$= 144 \times 5^2 \times 5^2$ $= 144 \times 25 \times 25$

$= 144 \times \frac{100}{4} \times \frac{100}{4}$ $= 9 \times 100 \times 100$

= 90,000

355. એક વિમાન 240 કિ.મી. પ્રતિ કલાક ની ઝડપે ઉડીને પાંચ કલાકમાં અ થી બ જગ્યાએ જાય છે જો આ અંતર 192 મિનીટમાં કાપવાનું થાય તો વિમાનની ઝડપ / દર કલાકની કેટલી હોવી જરૂરી છે?

A) 300 B) 360 C) 375 D) 400

વિમાનથી કપાયેલું અંતર = ઝડપ × સમય
= 240 કિ/ક × 5 કલાક
= 1200 કિ.મી.

∴ 1200 કિ.મી. માટે 192 મિનિટમાં કાપવામાં,

∴ ઝડપ = $\frac{\text{અંતર}}{\text{સમય}} = \frac{1200 \text{ કિ.મી}}{3\ 1/5 \text{ કલાક (192 મિનિટ)}}$

$= \frac{1200 \times 5}{16} = 375$ કિ/ક

GPSC Class - 2 - 02/04/2017

356. જો કોઈ કૂટભાષામાં HYDROGENને JCJZYSSD લખવામાં આવે છે, તો એ જ ભાષામાં ANTIMONYને ક્યા રૂપમાં લખવામાં આવે ?

A) CPVKOQPA B) CRZOWABO

C) ERXMQSRC D) GTZOSUTE

H Y D R O G E N
↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓
J C J Z Y S S D

આપેલ મૂળાક્ષર અને કોડ વચ્ચે સીધો સંબંધ છે, જે નીચે મુજબ છે.

+2 +4 +6 +8 +10 +12 +14 +16

જેના આધારે


A N T I M O N Y
↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓
C R Z Q W A B O

357. એક વ્યક્તિ પૂર્વ તરફ 7 કિમી ચાલે છે. બાદમાં પોતાની જમણી બાજુ 5 કિમી ચાલે છે. ફરીથી પોતાની જમણી બાજુ 7 કિમી ચાલે છે. બાદમાં પોતાની ડાબી બાજુ 2 કિમી ચાલે છે. તો તે પોતાના પ્રસ્થાનબિંદુથી કેટલે દુર હશે ?

A) 5 કિમી B) 12 કિમી C) 7 કિમી D) 14 કિમી

ઉત્તર

પશ્ચિમ



પૂર્વ

દક્ષિણ

તે વ્યક્તિ પ્રસ્થાન બિંદુથી 5 + 2 = 7 કિ.મી. દૂર હશે.

358. X અને Y ભાઈઓ છે.R, Yના પિતા છે.S, Tનો ભાઈ છે અને Xના મામા છે. તો Tનો R સાથે શો સંબંધ થઈ શકે ?

A)માતા B)પત્ની C)બહેન D)ભાઈ

S^+ ← ભાઈ — T^- ← પત્ની — R^+; R^+ — પિતા — Y^+; X^+ ← ભાઈઓ — Y^+; X^+ — મામા → S^+

ઉપર દર્શાવેલ આકૃતિ પરથી કહી શકાય કે T નો R સાથે પત્નીનો સંબંધ છે.

* નીચે આપેલી માહિતી વાંચીને પ્રશ્ન ક્રમાક 359 થી 361 ના જવાબ આપો.

(i) આઠ વ્યક્તિઓ E,F,G,H,I,J,K,L એક ચોરસ ટેબલ પર બેઠા છે. દરેક બાજુએ બે વ્યક્તિ બેઠા છે.

(ii) L અને F ની વચ્ચે J છે.

(iii) I અને F ની વચ્ચે G છે.

(vi) સ્ત્રી સભ્ય H એ J ની ડાબી બાજુએ બીજા ક્રમે બેઠી છે.

(v) પુરુષ સભ્ય F એ સ્ત્રી સભ્ય E ની એકદમ સામેની બાજુએ બેઠો છે.

(vi) F અને I ની વચ્ચે એક સ્ત્રી સભ્ય છે.

359. નીચેનામાંથી કયુ જૂથ ત્રણ સ્ત્રી સભ્યોનું છે ?

A)EHJ B)EGJ C)GHJ D)GHE

360. J વિશે નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ?

A)J એક પુરુષ સભ્ય છે. B)J એ સ્ત્રી સભ્ય છે.

C)J ની જાતી જાણી શકાય તેમ નથી

D) J નું સ્થાન જાણી શકાય તેમ નથી.

361. E અને H ની વચ્ચે કોણ બેઠેલું છે ?

A) I B)J C)K D)F

362. જો કોઈ વસ્તુની કિંમત 20% વધારવામાં આવે તો તેના ગ્રાહકે પોતાનો ખર્ચ વધે નહિ તે માટે તે વસ્તુનો ઉપભોગ કેટલા ટકા ઘટાડવો પડે ?

A) $16\frac{2}{5}\%$ B) $16\frac{2}{3}\%$ C) $16\frac{3}{2}\%$ D) $16\frac{3}{5}\%$

ઉપભોગમાં % ઘટાડો $= \frac{R}{100+R} \times 100$

$= \frac{20}{100+20} \times 100$

$= \frac{1}{6} \times 100 = 16\frac{2}{3}\%$

363. નીચે આપેલ કોયડામાં '?'ની જગ્યાએ કયો અંગ્રેજી મૂળાક્ષર આવે ?

(G, A, ?, J, P, F)

A)K B)N C)L D)M

આપેલ દરેક મૂળાક્ષરના સ્થાન અને તેની વિરુદ્ધ મૂળાક્ષરના સ્થાનનો સરવાળો '17' થાય છે. જેથી ખૂટતો મૂળાક્ષર 'K' આવશે.

નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016

364. ખાંડના ભાવમાં શરૂઆતમાં 20 % નો વધારો થાય છે. એક મહીના પછી ભાવમાં 20 % નો ઘટાડો થાય છે. ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર (net change) કેટલો હશે ?

A)કોઈ ફેરફાર નહીં થાય B)2 % નો વધારો

C)2 % નો ઘટાડો D)4 % નો ઘટાડો

X = +20%, Y = -20%

% ફેરફાર $= X + Y + \frac{XY}{100}$

$= +20 - 20 + \frac{20 \times (-20)}{100} = 0 + \frac{(-400)}{100}$

$= -4\%$

આથી, 4% ઘટાડો થશે.

નિર્દેશ :- (પ્રશ્ન 365 અને 366) નીચેના પ્રત્યેક પ્રશ્નમાં એક પ્રશ્ન અને ત્રણ વિધાન આપવામાં આવ્યાં છે. આ પ્રશ્ન અને વિધાનોનો અભ્યાસ કરી નિર્ણય કરો કે પ્રશ્નનો સાચો ઉત્તર આપવા કેટલા વિધાનો પર્યાપ્ત છે.

365. બે અંકની સંખ્યા કઈ હશે ?

વિધાન-1 : આ સંખ્યા અને તેના બન્ને અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત 27 છે.

વિધાન-2 : આ સંખ્યાના બન્ને અંકોનો તફાવત 3 છે.

વિધાન-3 : આ સંખ્યાનો એકમ અંક તેના દશક અંક કરતા 3 જેટલો ઓછો છે.

A)માત્ર વિધાન-1 અને વિધાન-2

B)માત્ર વિધાન-1 અને વિધાન-2 અથવા વિધાન-3

C)માત્ર વિધાન-1 અને વિધાન-3

D)ત્રણેય વિધાનો પર્યાપ્ત નથી.

366. Dને કેટલા બાળકો છે ?

વિધાન-1 : Aના પિતાને ત્રણ બાળકો છે.

વિધાન-2 : A અને Eની માતા P છે.

વિધાન-3 : D અને Pના લગ્નની તારીખ 25 ઓગસ્ટ છે.

A)માત્ર વિધાન-1 અને વિધાન-2

B)માત્ર વિધાન-2 અને વિધાન-3

C)ત્રણેય વિધાન આવશ્યક છે.


D)ત્રણેય વિધાનો પર્યાપ્ત નથી.

D^+ — પત્ની → P^-; D → પ્રથમ બાળક, A બીજું બાળક, E ત્રીજું બાળક

પ્રશ્નનો જવાબ મેળવવાં વિધાન-1, વિધાન-2 અને વિધાન-3 એમ ત્રણેય વિધાન આવશ્યક છે.

निर्देश :- (પ્રશ્ન 367 અને 371) નીચેની વિગતોનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો.

એક કુટુંબમાં છ સભ્યો P, Q, R, S, T અને U છે. તેમાં બે દંપતિ અને બે વિદ્યાર્થી છે. Q ડૉક્ટર છે તથા Tના પિતા છે. U, R ના દાદા છે. S, Tની દાદી છે અને તે ગૃહિણી છે. કુટુંબમાં એક કોન્ટ્રાકટર અને એક નર્સ છે.



367. Pનો પતિ કોણ છે ?

A)R B)U C)Q D)S

Pનો પતિ Q છે.

368. R અને T વચ્ચે કયો સંબંધ છે ?

A)ભાઈ-બહેન B)માતા-પુત્ર

C)ભાઈ-ભાઈ D)નિશ્ચિતપણે કહી ન શકાય

369. Uનો વ્યવસાય કયો છે ?

A)ડૉક્ટર B)નર્સ C)કોન્ટ્રાક્ટર D)વિદ્યાર્થી

Uનો વ્યવસાય કોન્ટ્રાક્ટર છે.

370. નીચે પૈકી દંપતી કોણ છે ?

A)US અને QT B)US અને QP

C)TS અને RU D)US અને RP

US અને QP એમ બે દંપતિ છે.

371. નીચે પૈકી કયું નિશ્ચિતપણે પુરુષ સભ્યોનું જૂથ છે ?

A)QU B)QUT C)QUP D)UT

QU એમ પુરુષ સભ્યોનું એક જૂથ છે.

GPSC Class - 2 - 12/02/2017

372. ડાબી બાજુ આપેલ જોડના તર્કનો આધાર લઈ જમણી બાજુની જોડ પૂરી કરો.


FGHI : OPQR : : BCDE : ....

A)KLMJ B)KLMN C)TUVW D)STUV



373. જો B = 2, BAT = 23 હોય તો BALL = કેટલા થાય?

A)25 B)28 C)27 D)26



374. નીચે દર્શાવેલમાં અસંગત શું છે?

A)બટેટા B)ડુંગળી C)લસણ D)ટમાટર

A) બટેટા, B) ડુંગળી અને C) લસણ જમીનના અંદરના ભાગમાંથી મળે છે એટલે કે કંદમૂળ છે. જ્યારે D) ટમાટર જમીનના ઉપરના ભાગમાંથી મળે છે.

375. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ વિસંગત છે.

A)ADFH B)LNOR C)HKMO D)SVXZ

A) A $\xrightarrow{+3}$ D $\xrightarrow{+2}$ F $\xrightarrow{+2}$ H

B) L $\xrightarrow{+2}$ N $\xrightarrow{+1}$ O $\xrightarrow{+3}$ R

C) H $\xrightarrow{+3}$ K $\xrightarrow{+2}$ M $\xrightarrow{+2}$ O

D) S $\xrightarrow{+3}$ V $\xrightarrow{+2}$ X $\xrightarrow{+2}$ Z

376. જો 6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂ.2100 હોય તો, 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય?

A)રૂપિયા 2540 B)રૂપિયા 2520

C)રૂપિયા 2100 D)રૂપિયા 2510

$\frac{M_1 D_1}{W_1} = \frac{M_2 D_2}{W_2}$ $M_1 = 6$ વ્યક્તિ

$D_1 = 15$ દિવસ

$\frac{6\times15}{2100} = \frac{9\times12}{W_2}$ $W_1 = 2100₹$

$M_2 = 9$ વ્યક્તિ

$W_2 = \frac{9\times12\times2100}{6\times15} = 2520₹$ $D_2 = 12$ દિવસ

$W_2 = ?$ દિવસ

377. ક, ખ તથા ગ અનુક્રમે રૂ.60,000 રૂ.80,000 અને રૂ.1,00,000 રોકીને એક ધંધો શરૂ કરે છે. વરસના અંતે રૂ. 36,000/- નો નફો થયો છે. તેમના રોકાણનું પ્રમાણ 3 : 4 : 5 નું છે, તો દરેકને કેટલા નફો મળશે?

A)ક-રૂ. 9,000, ખ-રૂ. 12,000, ગ-રૂ. 15,000

B)ક-રૂ. 10,000, ખ-રૂ. 11,000, ગ-રૂ. 15,000

C)ક-રૂ. 9,000, ખ-રૂ. 12,000, ગ-રૂ. 15,0000

D)ક-રૂ. 10,000, ખ-રૂ. 11,000, ગ-રૂ. 15,000

ક ખ ગ

રોકાણનું પ્રમાણ ⟶ 3 : 4 : 5

∴ કનું રોકાણ = 3/12 × 36000₹ = 9000₹

∴ ખનું રોકાણ = 4/12 × 36000₹ = 12000₹

∴ ગનું રોકાણ = 5/12 × 36000₹ = 15000₹

378. જો કોઈ કૂટ ભાષામાં SISTER ને RHRSDQ લખવામાં આવે છે, તો એ જ ભાષામા UNCLE ને કયા રૂપમાં લખવામાં આવે?

A) TMBKD B) TBMKD C) TVBOD D) TMKBD

-1	-1	-1	-1	-1	-1
S	I	S	T	E	R
↓	↓	↓	↓	↓	↓
R	H	R	S	D	Q

-1	-1	-1	-1	-1
U	N	C	L	E
↓	↓	↓	↓	↓
T	M	B	K	D

GPSC Class - 1 - 09/04/2017

379. 1024, 256, 64, ..., 4.

A) 12 B) 32 C) 16 D) 18

નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી પ્રશ્ન ક્રમાંક 380 થી 382ના જવાબ આપો.

(i) આઠ વ્યક્તિઓ A, B, C, D, E, F, G, H ઉત્તર તરફ મોં કરીને એક લાઈનમાં ઉભા છે.

(ii) E ની જમણી બાજુ ચોથા ક્રમે A છે.

(iii) D ની ડાબી બાજુ ચોથા ક્રમે H છે.

(iv) C અને F એ બન્ને લાઈનમાં અંતિમસ્થાનો પરે નથી તથા અનુક્રમે B અને E તેમના પાડોશીઓ છે.

(v) A ની તરત જ ડાબી બાજુ H છે તથા Aનો પાડોશી B છે.

સમજૂતી :

E F G H A B C D ↑

ડાબી બાજુ જમણી બાજુ

380. Fનું સ્થાન ક્યુ હશે ?

A) Eની તરત જ જમણી બાજુ B) Gની તરત જ જમણી બાજુ C) Dની જમણી બાજુ છઠ્ઠા ક્રમે D) G અને Hની વચ્ચે

381. નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

A) H અને Fનો પાડોશી G છે.

B) Aની તરત જ જમણી બાજુ B છે.

C) ડાબી બાજુ અંતિમસ્થાન પર E છે.

D) Bની તરત જ જમણી બાજુ D છે.

કેમ કે B તરત જ જમણી બાજુ C છે.

382. Dના પાડોશી કોણ છે ?

A) ફક્ત F B) ફક્ત C C) B અને C D) નિર્ધારીત ન કરી શકાય

383. નીચે દર્શાવેલ અક્ષરોમાં ચોક્કસ ક્રમને આધારે જે અક્ષરો બંધબેસતા નથી તેની પસંદગી કરો.

A) BDFH B) JLNP C) GIKM D) STVX

A) $B \xrightarrow{+2} D \xrightarrow{+2} F \xrightarrow{+2} H$

B) $J \xrightarrow{+2} L \xrightarrow{+2} N \xrightarrow{+2} P$ **A,B અને C એક સમૂહ છે.**

C) $G \xrightarrow{+2} I \xrightarrow{+2} K \xrightarrow{+2} N$

D) $S \xrightarrow{+1} T \xrightarrow{+2} V \xrightarrow{+2} X$

384. એક કાર અ સ્ટેશનથી બ સ્ટેશન પ્રતિકલાક 40 કિ.મીની ઝડપે જાય છે અને બ સ્ટેશનથી અ સ્ટેશન પ્રતિકલાક 60 કિ.મી.ની ઝડપે પરત આવે છે. તો પૂરી મુસાફરીની કારની સરેરાશ ઝડપ પ્રતિકલાક કેટલી થાય ?

A) 50 કિ.મી. B) 45 કિ.મી. C) 48 કિ.મી. D) 52 કિ.મી.

X = 40 કિ/ક, Y = 60 કિ/ક

સરેરાશ ઝડપ $= \frac{2XY}{X+Y} = \frac{2\times40\times60}{40+60} = \frac{2\times40\times60}{100}$

= 48 કિ.મી/કલાક

GPSC Class - 2 - 04/03/2017

385. જો 8 પુરૂષો 80 હેક્ટરના ખેતરને 24 દિવસમાં લખી શકે, તો 36 પુરૂષો 30 દિવસમાં કેટલા હેક્ટર ખેતરમાં લણણી કરી શકે?

A) 450 હેક્ટર B) 360 હેક્ટર C) 420 હેક્ટર D) 120 હેક્ટર

$\frac{M_1D_1}{W_1} = \frac{M_2D_2}{W_2}$

$\frac{8\times24}{80} = \frac{36\times30}{W_2}$

$W_2 = \frac{36\times30\times80}{8\times24} = 450$ હેક્ટર

$M_1 = 8$ પુરુષ

$D_1 = 24$ દિવસ

$W_1 = 80$ હેક્ટર

$M_2 = 36$ પુરુષ

$D_2 = 30$ દિવસ

$W_2 = ?$ હેક્ટર

386. 1, 8, ?, 64, 125

A) 21 B) 27 C) 36 D) 55

387. $\frac{8}{16}, \frac{11}{22}, \frac{17}{34}, ?$

A) 34/78 B) 28/46 C) 31/64 D) 23/46

388. $\frac{1}{3}\times\frac{3}{4}\div\frac{5}{4}\times\frac{5}{6}\div\frac{7}{6} = ?$

A) 1/3 B) 4/3 C) 1/7 D) 3/4

$= \frac{1}{3}\times\frac{3}{4}\div\frac{5}{4}\times\frac{5}{6}\div\frac{7}{6} = \frac{1}{3}\times\frac{3}{4}\times\frac{4}{5}\times\frac{5}{6}\times\frac{6}{7} = \frac{1}{7}$

389. એક ગામની વસ્તી 6,000 છે. પ્રતિ વર્ષ 10% ના દરે તેમાં વધારો થાય છે, તો ત્રણ વર્ષ પછી તે ગામની વસ્તી કેટલી હશે?

A) 7800 B) 7986 C) 7860 D) 7980

6000

1 વર્ષ ↓ +10% (+600)

6600

2 વર્ષ ↓ +10% (+660)

7260

3 વર્ષ ↓ +10% (+726)

7986

390. એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિદ્યાર્થી 118 ગુણ મેળવે છે. અને 32 ગુણથી નાપાસ થાય છે, તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

A) 250 B) 400 C) 300 D) 200

પાસિંગ ટકાવારી = 50% વિદ્યાર્થીના ગુણ = 118

હવે, જો વિદ્યાર્થી 32 ગુણથી નાપાસ થયો હોય, તો પાસિંગ ગુણ = 118 + 32 = 150 ગુણ

ટકાવારી	ગુણ
50%	150 ગુણ
100%	?

$= \frac{100 \times 150}{50}$ = **300 ગુણ**

391. છગનનો પગાર મગન કરતા 20% ઓછો છે, તો મગનનો પગાર છગન કરતા કેટલા ટકા વધુ થાય ?

A) 50% B) 25% C) 10% D) 40%

% ઓછો = 20% = 1/5

∴ મગનનો પગાર છગન કરતાં

% વધુ = 1/5-1 (અંશની કિંમત છેદમાંથી બાદ કરતાં)

= 1/4 = 25%

392. એક વસ્તુની કિંમત રૂ.200 છે અને તેની ઉપર ક્રમશઃ 25% અને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો તેની વેચાણ કિંમત કેટલી થશે.

A) 112 B) 90 C) 105 D) 125

200₹ ← વસ્તુની કિંમત

↓ 25% વળતર (-50₹)

150₹

↓ 30% વળતર (-45₹)

105₹ ← વેચાણ કિંમત

393. જો કોઈ કૂટ-ભાષામાં UNITEDનું SLGRCB લખવામાં આવે છે તો એ જ ભાષામાં DISOWNને ક્યા રૂપમાં લખવામાં આવે ?

A) BGOMUL B) CGRLTK C) CGRTLK D) BGQLUM

-2 -2 -2 -2 -2 -2 -2 -2 -2 -2 -2 -2

U N I T E D D I S O W N

↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓

S L G R C B B G Q M U L

આપેલ શબ્દના દરેક મૂળાક્ષરને સામેના કોડ સાથે ઉપર પ્રમાણે સીધો સંબંધ છે.

394. એક બસમાં જ્યારે મુસાફરી શરૂ થઈ ત્યારે કેટલાક યાત્રીઓ બેઠા હતા, પહેલા સ્ટોપ પર કુલ પૈકી અર્ધા મુસાફરો ઉતરી ગયા અને 35 મુસાફરો ચઢયા. બીજા સ્ટોપ પર 20% યાત્રીઓ ઉતરી ગયા અને 40 ચઢયા. ત્યારબાદ બસમાં 80 યાત્રીઓ હતા. તો શરૂઆતમાં બસમાં કેટલા યાત્રીઓ હશે ?

A) 25 B) 30 C) 40 D) 50

ધારો કે શરૂઆતમાં બસમાં યાત્રી = X

20% યાત્રી ઉતરી ગયા – 80% બચ્યા.

$$\left[\left(x-\frac{x}{2}+35\right)\times\frac{80}{100}\right]+40 \quad 80$$

$$\frac{2x-x}{2}+35=\frac{40\times100}{80}$$

$$\frac{x}{2}+35=50 \qquad \frac{x}{2}=50-35$$

$$\frac{x}{2}=15 \qquad x=30$$

GPSC Class - 2 - 18/03/2017

395. જો કોઈ કૂટ-ભાષામાં PALE ને 2134 લખવામાં આવે છે અને EARTH ને 41590 લખવામાં આવે છે, તો એ જ ભાષામાં PEARL ને ક્યા સ્વરૂપમાં લખવામાં આવે ?

A) 29530 B) 24153 C) 25413 D) 25430

P A L E E A R T H

↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓

2 1 3 4 4 1 5 9 0

અહીંયા શબ્દના દરેક મૂળાક્ષર સામે આપેલ નંબરને ઉદ્દેશે છે. જેથી,

P E A R L

↓ ↓ ↓ ↓ ↓

2 4 1 5 3

396. 24 : 3 :: 656 : ?

A) 117 B) 97 C) 82 D) 23

24÷8

24 : 3

656 : 82

656÷8

397. એક ક્રિકેટ ખેલાડીની 25 ઈનિંગ્સનો સરાસરી સ્કોર 40 રન છે. વધારાની એક ઈનિંગ્સ રમવાના કારણે તેના રનની સરેરાશ 3 રન વધી જાય છે. તો છેલ્લી વધારાની ઈનિંગ્સમાં કેટલા રન તેણે કર્યા હશે ?

A) 82 B) 98 C) 118 D) 43

25 ઈનિંગ્સનો સરેરાશ સ્કોર = 40 રન

∴ છેલ્લી ઈનિંગ્સના રન

= 40 રન (સરેરાશ રન) + 78 (26 ઈનિંગ્સ × 3 રન વધારો)

= 118 રન

GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર કલાસ - 2 (25/2/2017)

398. ? + 4699 + 1885 - 1047 = 21111

<u>A) 15574</u> B) 15674 C) 15754 D) 15764

X + 46 99 + 1885 - 1047 = 21111

X = 21111 + 1047 - 4699 -1885

X = 15574

399. જો 4200 × a = 3150 તો a = ?

A) 3/5 <u>B) 3/4</u> C) 1/4 D) 2/5

4200 × a = 3150

$a = \frac{3150}{4200} = \frac{315}{420} = \frac{3}{4}$

400. 0.0238 ÷ 17 = ?

A) 14 B) .014 <u>C) .0014</u> D) .00014

= 0.0238 ÷ 17

$= \frac{238}{1000} \div 17 = \frac{238}{1000} \times \frac{1}{17} = \frac{14}{1000} = 0.0014$

401. 875 x 207 - 875 x 107 = ?

A) 87,200 <u>B) 87, 500</u> C) 87,550 D) 87,350

= 875 × 207 - 875 × 107 = 875 (207 - 107)

= 875 × 100 **= 87,500**

402. નીચેનાને ચડતા ક્રમમાં ગોઠવો.

$\frac{3}{5}, \frac{6}{7}, \frac{7}{9}, \frac{9}{11}$

A) $\frac{3}{5}, \frac{6}{7}, \frac{7}{9}, \frac{9}{11}$ B) $\frac{6}{7}, \frac{7}{9}, \frac{3}{5}, \frac{9}{11}$ C) $\frac{9}{11}, \frac{7}{9}, \frac{6}{7}, \frac{3}{5}$ <u>D)</u> $\frac{3}{5}, \frac{7}{9}, \frac{9}{11}, \frac{6}{7}$

3/5 = 60%

6/7 = 86% (આશરે)

7/8 = 77.77%

9/11 = 81.81%

∴ ચઢતો ક્રમ = 3/5 < 7/9 < 9/11 < 6/7

403. $(-6)(6)(2)\left(-\frac{1}{2}\right)\left(\frac{3}{4}\right) = ?$

A) 10 <u>B) 27</u> C) 32 D) 42

$= (-6) \times 6 \times 2 \times \left(-\frac{1}{2}\right)\left(\frac{3}{4}\right)$

$= -36 \times -1 \times \frac{3}{4} = 9 \times 3 = 27$

404. MAGAZINE

1) MADAZINE 2) ENIZAGAM

3) MAGAZINE 4) ENIZAGAM

A) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ 1 જેવું દેખાય

B) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ 2 જેવું દેખાય

C) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ 3 જેવું દેખાય

<u>D) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ 4 જેવું દેખાય</u>

આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ 4 જેવું દેખાય.

405. ડાબી બાજુ આપેલ જોડના તર્કનો આધાર લઈ જમણી બાજુની જોડ પૂરી કરો.

PNLJ : IGEC : : VTRP :..............

<u>A) OMKI</u> B) RSTU C) QSRC D) RPOM

P –(-2)– N –(-2)– L –(-2)– J : I –(-2)– G –(-2)– E –(-2)– C (J → I : -1)

V –(-2)– T –(-2)– R –(-2)– P : <u>O –(-2)– M –(-2)– K –(-2)– I</u> (P → O : -1)

406. જો કોઈ કૂટ ભાષામાં HONESTYને 5132468 લખવામાં આવે છે અને POVERTYને 7192068 લખવામાં આવે છે, તો એ જ ભાષામાં HORSEને કયા રૂપમાં લખવામાં આવે ?

A) 51024 <u>B) 51042</u> C) 50124 D) 52014

H	O	N	E	S	T	Y		P	O	V	E	R	T	Y
↓	↓	↓	↓	↓	↓	↓		↓	↓	↓	↓	↓	↓	↓
5	1	3	2	4	6	8		7	1	9	2	0	6	8

આપેલ શબ્દનાં દરેક મૂળાક્ષર સામે આપેલ નંબરને ઉદ્દેશે છે. જેથી,

H	O	R	S	E
↓	↓	↓	↓	↓
5	1	0	4	2

GPSC Class - 2 - 5/3/2017

407. 1 જાન્યુઆરી 2006નાં રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2010ના રોજ કયો વાર હશે ?

A) મંગળ B) બુધ <u>C) ગુરૂ</u> D) શુક્ર

જો 1 જાન્યુઆરી, 2006ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી, 2010ના રોજ ગુરુવાર હશે.

408. $112 \times (5)^4$ **= કેટલા થાય ?**

A) 67,000 <u>B) 70,000</u> C) 76,000 D) 77,200

$= 112 \times 5^4 = 112 \times 5^2 \times 5^2 = 112 \times 25 \times 25$

$= 112 \times \frac{100}{4} \times \frac{100}{4} = 7 \times 100 \times 100 =$ **70,000**

409. ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદુ વ્યાજ મળીને રકમ 815 રૂ. થાય છે. ચાર વર્ષનું સાદુ વ્યાજ અને મુદ્દલ મળીને રૂ.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

A) 650 B) 590 <u>C) 698</u> D) 700

ત્રણ વર્ષે રકમ 815

<u>ચાર વર્ષે રકમ 854</u>

1 વર્ષમાં સા.વ્યા. 39₹

1 વર્ષમાં સા.વ્યા. = 39₹ = 39 × 3 = 117₹

3 વર્ષમાં સા.વ્યા. = ?

∴ ત્રણ વર્ષના અંતેની રકમમાંથી ત્રણ વર્ષનું સા.વ્યાજ બાદ કરતાં,

મુદ્દલ = 815₹ - 117₹ = 698₹

410. નીચેના પૈકી કઈ સંખ્યા ક્રમબદ્ધ નથી.

8, 27, 64, 100, 125, 216, 343

A)-27 B)100 C)125 D)343

411. એક ધંધામાં અ અને બ 3:2ના પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી કરે છે. કુલ નફામાંથી 5% નફો ધર્માદામાં આપ્યાબાદ અ ને 8550 રૂા. નફાનો ભાગ મળે છે. આ સંજોગોમાં કુલ નફો કેટલો હશે?

A)14250 B)15000 C)16000 D)15775

અ : બ

3 : 2

2850 × ↓ ↓ 2850 ×

8550₹ + 5700₹ = 14,250₹

14250₹ એ 5% ધર્માદા બાદની એટલે 95% રકમ છે.

∴ 95% 14250₹ $= \frac{100 \times 14250}{95} = 15000$₹

100% ?

412. A, B, C અને D ને 5 : 2 : 4 : 3 નાં પ્રમાણમાં રકમ વહેંચવાની થાય છે. C ને D કરતા રૂા. 2000 વધ મળે છે. તો B ને કુલ કેટલા રૂપીયા મળશે.

A)8,000 B)10,000 C)4,000 D)6,000

A : B : C : D

↓ ↓ ↓ ↓

5 : 2 : 4 : 3 1 યુનિટ વધુ

1 યુનિટ = 2000₹ = 2 × 2000₹

2 યુનિટ = ? = 4000₹

GPSC Class - 2 - 11/12/2016

413. 16 : 56 : : 32 : .... ખાલી જગ્યા પુરો.

A)112 B)144 C)128 D)96

(×2) 16 : 56 (×2)

32 : 112

414. જો F = 6 અને MAT = 34 હોય તો CAR = ...

A)21 B)22 C)25 D)28


F નું સ્થાન = 6 તેજ પ્રમાણે,

M A T = 34 C A R

13 1 20 (13+1+20) = 34 3+1 +18 = 22

415. 'અ'એ 'બ' અને 'ક'ની માતા છે. 'બ' એ 'અ'નો પુત્ર છે. 'ક'એ 'અ'નો પુત્ર નથી. આ સંજોગોમાં 'ક'નો 'અ' સાથે શું સંબંધ રહેશે ?

A)જમાઈ B)પૌત્રી C)પુત્રી D)પૌત્ર



ઉપર દર્શાવેલ આકૃતિ પરથી કહી શકાય કે 'ક'નો 'અ' સાથે પુત્રીનો સંબંધ રહેશે.

416. રમણના પરિણામ મુજબ પ્રથમથી તે 16મો અને છેલ્લેથી 15મો નંબર આવે છે. આ સંજોગોમાં વર્ગમાં કેટલા બાળકો હશે ?

A)30 B)31 C)32 D)33

રમણના પરિણામ મુજબ પ્રથમથી તે 16મો અને છેલ્લેથી 15મો નંબર આવે છે. તો આ સંજોગોમાં વર્ગના કુલ બાળકોની સંખ્યા (15-1=14+16=30) = 30 થશે.

GPSC Class - 2 - 05/02/2017

417. 27 : 125 : : 64 : ?

A)517 B)162 C)216 D)273

$(3)^3$: $(5)^3$ 64 : 216

27 : 125 $(4)^3$: $(6)^3$

418. જો એન. એની બહેન છે અને એ ક્યુની પત્નિ છે. ક્યુ એ બીનો પુત્ર છે તો એ અને બી વચ્ચે શું સંબંધ થાય.

A)પુત્રી B)પુત્રવધુ C)પત્નિ D)માતા

B
↓ પુત્ર
N⁻ ← બહેન A⁻ ← પત્ની Q⁺

આકૃતિ પ્રમાણે A નો B સાથે પુત્રવધુનો સંબંધ છે.

419. નીચેનામાં ખૂટતી સંખ્યા શોધો?

17	13	19
12	11	16
25	17	?

A)9 B)16 C)26 D)36

420. 30 વ્યકિતઓ એક રૂમમાં છે, તે પૈકી 18 વ્યકિતઓ શતરંજ રમે છે અને 19 વ્યકિતઓ કેરમ રમે છે અને 10 વ્યકિતઓ બંને રમત રમે છે. આથી શતરંજ કે કેરમ બે માંથી એકપણ રમત ન રમતા હોય તેવી વ્યકિતઓ કેટલી?

A)2 B)7 C)5 D)3

8 (10) 9
શતરંજ 18 કેરમ 19

30 વ્યક્તિ શતરંજ + કેરમ + બંને રમનાર

= 8 + 10 + 9 = 27

∴ એકપણ રમત ન રમનાર


= 30 - 27 = 3 વ્યક્તિ

421. ડાબી બાજુ આપેલ જોડના તર્કનો આધાર લઈ જમણી બાજુની જોડ પૂર્ણ કરો.

ROAD : URDG : : SWAN : ?

A)VXDEQ B)VZDQ C)VZDP D)UXDQ

R O A D : U R D G (+3 each)



422. 4500 × ? = 3375

A) 2/5 B) 3/4 C) 1/4 D) 3/5

4500 × X = 3375

$X = \frac{3375}{4500}$ $X = \frac{3}{4}$

423. 39 વિદ્યાર્થીઓની સરેરશ ઉંમર 15 વર્ષની છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમરમાં 3 માસનો વધારો થાય છે તો શિક્ષકની ઉંમર કેટલી હશે?

A) 25 વર્ષ B) 20 વર્ષ C) 30 D) 35 વર્ષ

39 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર = 15 વર્ષ

∴ શિક્ષકની ઉંમર

= 15 વર્ષ(સરેરાશ જેટલા)+10 વર્ષ (3/2 વર્ષ×40) = 25 વર્ષ

424. 1 ટકાના અડધાને કેવી રીતે લખાય?

A) 0.05 B) 0.005 C) 0.02 D) 0.2

$\frac{1\%}{2} = \frac{1}{100 \times 2}$ $(\because 1\% = \frac{1}{2})$ $= \frac{1}{200}$ $= 0.005$

425. એક વ્યક્તિ એક વસ્તુ રૂપિયા 27.50 પૈસામાં ખરીદે છે અને રૂ.28.50 પૈસામાં વેચી દે છે તો તેને કેટલા ટકા નફો થયો હશે?

A) 6 % B) 3 % C) 4 % D) 4.5 %

મૂ.કિ. = 27.50 પૈસા વે.કિ. = 28.50 પૈસા

નફો = વે.કિ. - મૂ.કિ. = 28.5 - 27.5 = 1 પૈસા


$\%\text{નફો} = \frac{\text{નફો}}{\text{મૂ.કિ.}} \times 100 = \frac{1}{27.5} \times 100 = 3.64 \approx 4\%$

GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017

426. નીચે દર્શાવેલ પ્રશ્નમાં ચોક્કસ અનુક્રમને અનુસરવામાં આવેલ છે, તેને વિચારણામાં લઈને સાચો વિકલ્પ પસંદ કરો.

EHM, DIP, CJS, BKV, ?

A) AMY B) ALY C) CMZ D) ANY



આપેલ મૂળાક્ષર શ્રેણીમાં મૂળાક્ષરને ઉપર પ્રમાણે સંબંધ છે.

427. રવિના જીવનનો એક ચતુર્થાંશ ભાગ એક નાના છોકરા તરીકે વીત્યો, એક પંચમાંશ ભાગ કિશોરવસ્થામાં, એક તૃતીયાંશ ભાગ પુખ્તવયના પુરુષ તરીક અને 13 વર્ષ વૃદ્ધાવસ્થામાં વીત્યા તો તેની વર્તમાન ઉંમર કેટલી હશે?

A) 70 વર્ષ B) 80 વર્ષ C) 60 વર્ષ D) 65 વર્ષ

રવિની વર્તમાન ઉંમર = X વર્ષ લેતાં,

$\frac{x}{4} + \frac{x}{5} + \frac{x}{3} = \frac{15x + 12x + 20x}{60} = \frac{47x}{60}$

વૃદ્ધાવસ્થા $= x - \frac{47x}{60} = \frac{13x}{60}$ વર્ષ

$\therefore \frac{13x}{60} = 13$ વર્ષ (વૃદ્ધાવસ્થા) $x = 60$ વર્ષ

428.

29	87	261
41	?	164

A) 67 B) 56 C) 112 D) 82

- 29 × 3 = 87 87 × 3 = 261
- 41 × 2 = 82 82 × 2 = 164


429. 36 × 256 = 48 × ?

A) 192 B) 128 C) 156 D) 164

36 × 256 = 48 × X

$X = \frac{36 \times 256}{48}$ X = 12×16 X = 192

430. સૂચનાઃ નીચે આપેલ ચિત્રો જોઈ તાર્કિક રીતે '?' ના સ્થાને (1) થી (4) પૈકી કયુ ચિત્ર આવે તે જણાવો.



A) આપેલ '?' ના સ્થાને (1) આવે

B) આપેલ '?' ના સ્થાને (2) આવે

C) આપેલ '?' ના સ્થાને (3) આવે

D) આપેલ '?' ના સ્થાને (4) આવે

431. એક વ્યક્તિ પોતાની પત્નીથી 3 વર્ષ મોટો છે અને પોતાના પુત્રની વયથી ચાર ગણી વય ધરાવે છે. જો ત્રણ વર્ષ પછી પુત્રની વય 15 વર્ષ થઈ જવાની હોય તો તે સમયે પત્નીની ઉંમર કેટલી થઈ જશે?

A) 60 વર્ષ B) 51 વર્ષ C) 48 વર્ષ D) 45 વર્ષ

ત્રણ વર્ષ પછી પુત્રની વય = 15 વર્ષ

∴ હાલ પુત્રની વય = 15 વર્ષ - 3 વર્ષ = 12 વર્ષ

હવે, વ્યક્તિની ઉંમર પુત્રથી 4 ગણી છે.


∴ વ્યક્તિની ઉંમર= 4 × પુત્રની ઉંમર = 4×12 વર્ષ

= 48 વર્ષ

∴ પત્નીની ઉંમર = વ્યક્તિની ઉંમર - 3 વર્ષ = 48 - 3

= 45 વર્ષ

432. ઉતરોક્ત ઘન (Cube)ની બે સ્થિતિઓના આધારે જણાવો કે અંક 4 ની સામે કયો આંકડો આવશે.



A) 1 B) 2 C) 3 D) 4

ઉપરોક્ત ઘનની બે સ્થિતિઓના આધાર અંક 4ની સામે 2 આવશે.

433. (400 + 32) x (648 + 18) = ?

A)425 B)430 C)450 D)435

$= (400 \div 32)\times(648 \div 18)$

$= \frac{400}{32}\times\frac{648}{18} = 100\times\frac{81}{18} = 100\times\frac{9}{2} = 450$

434. ·6 x ·06 x ·006 x 60 = ?

A)12960 B).12960 C)0.01296 D).0012960

$= 0.6 \times 0.06 \times 0.006 \times 6 \times 10$

$= \frac{6}{10} \times \frac{6}{100} \times \frac{6}{1000} \times 6 \times 10$

$= \frac{1296}{10\times100\times100}$ = **0.01296**

ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017

435. 150ના 30%

A) 25 B) 35 C) 45 D) 55

$150 \times \frac{30}{100} = 45$

436. કમલ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. વિમલ કમલ કરતા 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ એ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?

A) 14 દિવસ B) 12 દિવસ C) 10 દિવસ D) 15 દિવસ

	કમલ		વિમલ
કાર્યક્ષમતા (ઝડપ)	100		150
	2	:	3
સમય	3	:	2
	↓×5		↓×5
	15 દિવસ		10 દિવસ

437. એક વસ્તુ રૂ.651માં વેચવાથી 7% નુકશાન થાય છે તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ?

A) 744 B) 751 C) 793 D) 700

વે.કિ. = 651 ₹ %નુકસાન = 7%

મૂ.કિ. = ?

મૂ.કિ. = $\frac{100}{100 - \text{\%નુકશાન}}$ × વે.કિ.

મૂ.કિ. = $\frac{100}{100-7} \times 651 = \frac{100}{93}\times651 = 700$ ₹

438. એક વ્હિલનો વ્યાસ 3.5 મીટર છે. તે 11કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલીવાર રાઉન્ડ ફરશે ?

A) 800 B) 900 C) 1000 D) 1100

રાઉન્ડની સંખ્યા = $\frac{\text{કુલ કપાયેલ અંતર}}{\text{વ્હિલનો પરીઘ}} = \frac{\text{11 કિ.મી.}}{2\pi r}$

$= \frac{\text{11000 મી}}{2\times\frac{22}{7}\times\frac{\text{35 મી}}{2\times10}} = 1000$

439. અનિકેત દ્વારા ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલ કુલ માર્ક્સ અંગ્રેજીના માર્ક્સ કરતા 100 વધુ છે. તેણે અંગ્રેજીમાં કેટલા માર્ક્સ મેળવ્યા હશે ? ત્રણ વિષયના સરેરાશ માર્ક 60 છે.

A) 60 B) 40 C) 80 D) 100

440. જો ચોરસના એક બાજુની લંબાઈ 5.2 સે.મી. હોય તો તેનો વિસ્તાર કેટલો હશે ?

A) 25.04 સેમી² B) 26.06 સેમી²

C) 27.04 સેમી² D) 28.08 સેમી²



5.2 સેમી

ચોરસની એક બાજુની લંબાઈ = 5.2 સે.મી.

ચોરસનું ક્ષેત્રફળ = a^2 = $(5.2)^2$ = **27.04 સેમી²**

441. જો એક લંબચોરસ મેદાનની લંબાઈ અને પહોળાઈ 3:2ના પ્રમાણમાં હોય. તેની પરિમિતિ 80 મી.હોય તો તેની પહોળાઈ મીટરમાં કેટલી થાય ?

A) 18 મીટર B) 16 મીટર C) 10 મીટર D) 24 મીટર

લંબાઈ(l) : પહોળાઈ (b)

3 : 2

3X 2X

લંબાઈની પરિમિતિ = 2 (l + b)

80 મી = 2 (l + b)

$\frac{80}{2} = 3X + 2X$ $40 = 5X$ $X=8$

પહોળાઈ = 2X = 2×8 = **16 મીટર**

442. એક વ્યક્તિને કહ્યું કે એક અંકએ 50 વડે ગુણે પરંતુ તેણે ભૂલથી 30 વડે ગણ્યા. તેનો જવાબ સાચા જવાબ કરતાં 400 ઓછો આવ્યો. તો તે અંક કયો હશે કે જેને ગુણવાનો હતો ?

A) 10 B) 20 C) 30 D) 40

સંખ્યા = X

સાચો જવાબ = 50X ખોટો જવાબ = 30X

50X - 30X = 400 20X = 400

X = 20

443. જો 1/4 ભાગની ટાંકી 135 લીટર પાણીથી ભરાય છે. આપેલ છે કે ટાંકીમાં 180 લીટર પાણી છે તો ટાંકીનો કેટલો ભાગ ભરાયો હશે ?

A) $\frac{2}{5}$ B) $\frac{2}{3}$ C) $\frac{1}{3}$ D) $\frac{1}{6}$

135 લિટર પાણી → 1/4 ભાગ $= \frac{180 \times 1/4}{135}$

80 લિટર પાણી → ?

$= \frac{180}{135\times4} = \frac{45}{135} = \frac{1}{3}$

444. $7^5 - 7^3 = ?$

A) 16464 B) 16644 C) 16446 D) 16444

$7^5 - 7^3 = 7^3(7^2-1) = 343(49-1) = 343 \times 48$

$= 16464$

445. એક ટ્રેન 81 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલે છે. તે રેલવે ટ્રેકની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને 12 સેકન્ડમાં પાર કરે છે. ટ્રેનની લંબાઈ કેટલી હશે ?

A) 270 મી B) 120 મી C) 12 મી D) 125 મી

અંતર (ટ્રેનની લંબાઈ) = ઝડપ × સમય

ટ્રેનની લંબાઈ = 81 કિ/ક × 12 સેકન્ડ


$= 81 \times \frac{5}{18}$ મી/સે. × 12 સેકન્ડ

= 270 મીટર

446. 5 સતત અંકોની સરેરાશ 7 થાય છે. સૌથી મોટો અંક ક્યો હશે?

A) 7 B) 8 C) 9 D) 10

5 સતત અંકોની સરેરાશ = 7



આથી, મોટો અંક = 9

447. 40 બાળકોની લાઈનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે તો તે ડાબી બાજુથી ક્યા ક્રમે હશે ?

A) 25મો B) 27મો C) 24મો D) 26મો


મોહનનો ડાબીબાજુથી ક્રમ

(14-1 = 13, 40-13 = 27) 27મો હશે.

448. જો 321465987 સંખ્યાના આંકડાને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા આંકડા જે તે સ્થળે જ રહેશે ?

A) એકપણ નહી B) એક C) બે D) ત્રણ

3 2 1 4 6 5 9 8 7



ચઢતો ક્રમ 1 2 3 4 5 6 7 8 9

449. 54638 સંખ્યામાં જો 1ને બધા જ એકી સંખ્યાના અંકોમાંથી બાદ કરવામાં આવે અને 1ને બેકી સંખ્યાના અંકોમાં ઉમેરવામાં આવે તો નવી સંખ્યાના બધા અંકોનો સરવાળો કેટલો થશે ?

A) 28 B) 25 C) 27 D) 29

54638

એકીમાંથી 1 અંક બાદ કરતાં અને બેકીમાં 1 અંક ઉમેરતાં,

5 4 6 3 8

↓ ↓ ↓ ↓ ↓

4 5 7 2 9

હવે, અંકોનો સરવાળો = 4+5+7+2+9 = 27

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

450. એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10 % ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ....

A) 1% વધે B) 1% ઓછો થાય

C) 0.1% વધે D) કોઈ ફેર ના પડે

X = +10% Y = -10%

% ફેરફાર $= X + Y + \frac{XY}{100} = 10 - 10 + \frac{10 \times -10}{100}$

$= 0 - 1 = -1\%$

ઋણ નિશાની 1% ઘટાડો દર્શાવે.

451. એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ?

A) 82% B) 72% C) 42% D) 62%

X = +40% Y = +30%

% ફેરફાર $= X + Y + \frac{XY}{100} = 40 + 30 + \frac{40 \times 30}{100}$

= 70+12 = +82%

82% જેટલું ક્ષેત્રફળ વધેલું ગણાય.

452. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો .... થશે.

A) 58 B) 49 C) 60 D) 54

3 વર્ષ પહેલા પિતા + પુત્રની ઉંમરનો સરવાળો = 40 વર્ષ

∴ 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો

= 40 વર્ષ + 18 વર્ષ (2×9 વર્ષ) = 58 વર્ષ

(અહીં 3 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી એટલે કે 9 વર્ષનો સમયગાળો છે. આથી 2×9 વર્ષ = 18 વર્ષ)

453. (a, b)નો ગુ.સા.અ. 18 છે. તો લ.સા.અ. .... શક્ય નથી.

A) 72 B) 48 C) 108 D) 36

લ.સા.અ.ની કિંમતને હંમેશા ગુ.સા.અ.ની કિંમત દ્વારા ભાગી શકાય છે.

∴ 48 વિકલ્પ એક જ એવો છે. જેને 18 વડે ભાગી શકાતો નથી.

454. $\frac{0.2 \times 0.2 + 0.8 \times 0.8 + 2 \times 0.16}{0.2 + 0.8} = ?$

A) 0.8 B) 1.0 C) 0 D) 0.2

0.2 = a 0.8 = b લેતાં,

$= \frac{a \times a + b \times b + 2(a \times b)}{a+b}$

$= \frac{a^2 + 2ab + b^2}{a+b} = \frac{(a+b)^2}{a+b}$

$= a + b = 0.2 + 0.8 = 1$

155. $\dfrac{\dfrac{4}{13}-\dfrac{2}{7}}{\dfrac{8}{13}}=$ .....

A) $\frac{8}{39}$ B) $\frac{13}{24}$ C) $\frac{2}{7}$ D) $\frac{1}{28}$

$$=\frac{\frac{4}{13}-\frac{2}{7}}{\frac{8}{13}}=\frac{\frac{28-26}{91}}{\frac{8}{13}}=\frac{\frac{2}{91}}{\frac{8}{13}}=\frac{2}{91}\times\frac{13}{8}=\frac{1}{28}$$

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

156. એક સેલ્સમેન એક ખુરશી રૂ.3000માં ખરીદી રૂ.2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

A) 18% B) 7% C) 30% D) 10%

મૂ.કિ. = 3000₹ વે.કિ. = 2700₹


ખોટ = મૂ.કિ. - વે.કિ.

= 3000 - 2700 = 300₹

%ખોટ = $\frac{\text{ખોટ}}{\text{મૂ.કિ.}}\times 100$ = $\frac{300}{3000}\times 100$ = 10%

57. રૂ.1000નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

A) 220 B) 100 C) 210 D) 200



ચ.વ્યા = 100₹ + 100₹ + 10₹

= 210₹

58. 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો .... છે.

A) 131 B) 151 C) 121 D) 141

31 અને 47 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ,

= 37, 41, 43

∴ આ અવિભાજ્યોનો સરવાળો = 37 + 41 + 43 = 121

59. $\sqrt{3+\sqrt[3]{x}}=3$નો ઉકેલ .... છે.

A) 27 B) 126 C) 216 D) 621

$\sqrt{3+\sqrt[3]{x}}=3$ $3+\sqrt[3]{x}=3^2$

$\sqrt[3]{x}=6$ $x=6^3$ $=216$

50. 1.02 x 1.08 = ...

A) 1.0116 B) 1.1016 C) 1.1106 D) 11.016

= 1.02 × 1.08

$=\frac{102}{100}\times\frac{1.08}{100}=\frac{11016}{100\times100}=1.1016$


461. રૂ.12000નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત .... છે.

A) 95 B) 0 C) 115 D) 112

1 વર્ષનું સા.વ્યા. અને ચ.વ્યા. વચ્ચે કોઈ તફાવત શૂન્ય હશે. કેમ કે, બન્ને વ્યાજ મૂળ રકમ પર જ ગણેલ હશે. વ્યાજનો તફાવત બીજા વર્ષથી મળશે.

462. જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ .... એકમ થાય.

A) 28.4 B) 10.8 C) 5.4 D) 7.29



ચોરસની પરિમિતિ

= 4 × એકબાજુનું માપ

= 4 × 2.7 એકમ

= 10.8 એકમ

463. એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર .... છે.

A) 25 B) 30 C) 15 D) 20

છોકરાની હાલની ઉંમર = X વર્ષ

પાંચ વર્ષની ઉંમર = X+5 વર્ષ

X + X + 5 = 35 2X = 35-5 2X = 30

X = 15

464. $6-2\frac{3}{5}=$..... થાય છે.

A) $3\frac{2}{5}$ B) $5\frac{3}{2}$ C) $3\frac{5}{2}$ D) $5\frac{2}{3}$

$=6-2\frac{3}{5}$ $=6-\frac{13}{5}$ $=\frac{30-13}{5}$

$=\frac{17}{5}$ $=3\frac{2}{5}$

465. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ?

A) 5.0099 B) 5009.99 C) 5009.92 D) 509.99

5009.99 > 5009.92 > 509.99 > 5.0099

466. એક ટન ચોખાનો ભાવ રૂ.85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ .... રૂપિયા થાય.

A) 4250 B) 8250 C) 425 D) 6750

1 ટન = 1000 કિ.ગ્રા

1 ક્વિન્ટલ = 100 કિ.ગ્રા.

1000 કિ.ગ્રા = 85000₹

50 કિ.ગ્રા (અડધા ક્વિન્ટલ) = ?

$=\frac{50\times85000}{100}$ = 4250₹

GS

467.

468

4

GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016

467. ગીરના અભયારણ્યમાં 2001માં કુલ 12000 પશુ હતા. 2011માં પશુની સંખ્યામાં 25.5 % વધારો થયો હોય તો કેટલા પશુ નવા ઉમેરાયા હશે ?

A)4000 B)3000 C)3060 D)એકેય નહીં

2001માં પશુ = 12000

2011માં 25.5%નો વધારો,

$= 12000 \times \frac{25.5}{100}$

$= 120 \times \frac{255}{10} = 12 \times 255$

= 3060

468. કમળ = 1 2 3 તથા ચરણ = 7 8 9 તો મરણ = ?

A)4 5 3 B)2 7 9 C)2 8 9 D)એકેય નહીં


ક → 1, મ → 2, ળ → 3 ; ચ → 7, ર → 8, ણ → 9

શબ્દના દરેક મૂળાક્ષર સામે આપેલ અંકને ઉદ્દેશે છે. જેથી

મ → 2, ર → 8, ણ → 9

469. જયેશ અને નીતલ એક થાંભલાથી વિરૂદ્ધ દિશામાં જાય છે. જયેશ 4 કિ.મી. અને નીતલ 6 કિ.મી. કલાકની ઝડપે જાય છે. તો 3 કલાક પછી બન્ને એક-બીજાથી કેટલા કિ.મી. દૂર હશે ?

A)32 B)30 C)40 D)એકેય નહીં



$4 \times 3 = 12$

$+ 6 \times 3 = 18$

30 કિ.મી. દૂર હશે.

470. રેખાબેન તેમનું જૂનું ડાયનીંગ ટેબલ 24 % ખોટ ખાઈને રૂ.950માં વેચી દે છે આ ટેબલ તેમણે શી કિંમતે ખરીદ્યુ હશે ?

A)રૂ.1500માં B)રૂ.1750માં C)રૂ.1250માં D)એકેય નહીં

વે.કિ. = 950₹ %ખોટ = 24%

મૂ.કિ. = ?

$\text{મૂ.કિ.} = \frac{100}{100 - \text{\%ખોટ}} \times \text{વે.કિ.} = \frac{100}{100-24} \times 950$

$= \frac{100}{76} \times 950$ **= 1250₹**

471. એક કિલ્લામાં 2000 સૈનિકો માટેનો 50 દિવસનો ખોરાક છે. 10 દિવસ પછી થોડા બીજા સૈનિક આવવાથી હવે તે ખોરાક 25 દિવસ ચાલે તેટલો છે. તો કેટલા વધારે સૈનિક આવ્યા હશે ?

A)1200 B)1500 C)1000 D)એકેય નહીં

1 દિવસ પછી બીજા સૈનિક આવે છે.

આથી બાકી દિવસ = 50-10 = 40 દિવસ

$M_1D_1 = M_2D_2$

$2000 \times 40 = (2000 + x)25$

$\frac{2000 \times 40}{25} = 2000 + x$

$32000 = 2000 + x$

$x = 1200$ સૈનિક

$M_1 = 2000$

$D_1 = 40$ દિવસ

$M_2 = 2000 + x$

$D_2 = 25$ દિવસ

GIDC CLERK CUM TYPIST - 20/11/2016

472. જો એક નંબર તેના 3/5 મા ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે

A) 125 B) 150 C) 200 D) 225

નંબર = X

$X - \frac{3}{5}X = 80$ $5X - 3X = 80 \times 5$ **X = 200**

473. BDGK : LNQU :: EGJN

A) OPTX B) OQTX C) PRTX D) PRUY

B —(+2)— D —(+3)— G —(+4)— K —(+1)→ L —(+2)— N —(+3)— Q —(+4)— U


E —(+2)— G —(+3)— J —(+4)— N —(+1)→ O —(+2)— Q —(+3)— T —(+4)— X

દરેક મૂળાક્ષરને ઉપર પ્રમાણે સંબંધ છે જેથી.

474. B અને C એ S ના ભાઈઓ છે.B એ M અને N નો પુત્ર છે.M એ K ની પુત્રી છે.R એ N ના સસરા છે.Q એ R નો પુત્ર છે. હવે T એ K નો ભાઈ હોય તો Q સાથે T નો સંબંધ શું ?

A) પિતા B) મામા

C) ભત્રીજો D) ઉપર પૈકી કોઈ નહી



ઉપરની આકૃતિ પરથી કહી શકાય કે T, Qના મામા છે.

475. જવાબ શોધો.

$9 - 8 \div 2 + 9 \times 3 - \frac{28}{4}$

A) 25 B) 20 C) 20.5 D) 21


$= 9 - 8 \div 2 + 9 \times 3 - \frac{28}{4}$

$= 9 - 4 + 9 \times 3 - 7$ $= 9 - 4 + 27 - 7$

$= 5 + 20$ $= 25$

476. છ મિત્રોનું એક ગ્રુપ ષટ્કોણ આકારના ટેબલની આજુબાજુ તેના દરેક ખૂણા પર બેઠેલ છે. સોનલ એ વિધીની સામે બેઠી છે.લીલા એ શીવની બાજુમાં બેઠી છે.સંજય એ શીવની સામે પણ સોનલની બાજુમાં નથી ધીર ની પોતાની અને વિધી વચ્ચે એક જણ બેઠેલ છે. જો સંજય એ ધીરની જમણી બાજુએ બેઠેલ હોય તો ધીરની ડાબી બાજુએ કોણ બેઠેલ હશે ?


A) વિધી B) લીલા C) શીવ <u>D) સોનલ</u>



ધીરની ડાબી બાજુએ સોનલ છે.

477. અમુક ચોક્કસ ભાષામાં APRIL = EQSOM અને AUGUST = EAHATU હોય તો, SEPTEMBER=?

A) TIQUINCIT <u>B) TIQUINCIS</u>
C) TIQUICNIS D) IIQUINCIS



શબ્દના દરેક મૂળાક્ષર સામેના મૂળાક્ષરને ઉદ્દેશે છે, તેથી,

S E P T E M B E R
↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓
T I Q U I N C I S

478. જો એક અપૂર્ણાંકના અંશમાં 300% ના વધારો અને છેદમાં 340% નો વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે ?

A) 2/11 B) 6/11 <u>C) 4/5</u> D) 4/10

અંશની કિંમત = X છેદની કિંમત = Y

Xમાં 300% વધારો = X × 400%

Yમાં 340% વધારો = Y × 440%

$\frac{X \times 400\%}{Y \times 440\%} = \frac{8}{11}$ $\frac{X}{Y} = \frac{8}{11} \times \frac{44}{40} = \frac{4}{5}$

479. સીમા તેના પતિ અજય કરતાં 6 વર્ષ નાની છે.અને અજય તેની દિકરી ઋતા કરતાં 5 ગણો મોટો છે. ઋતાની ઉંમર 3 વર્ષ પહેલાં 5 વર્ષ હોય તો, સીમાની હાલની ઉંમર કેટલી હશે ?

A) 35 <u>B) 34</u> C) 39 D) 40

ઋતાની ઉંમર ત્રણ વર્ષ પહેલા = 5 વર્ષ

∴ હાલ ઋતાની ઉંમર = 8 વર્ષ

∴ અજયની ઉંમર = 5 × ઋતાની ઉંમર = 5×8 વર્ષ = 40 વર્ષ

∴ સીમાની ઉંમર= અજયની ઉંમર - 6 વર્ષ = 40-6 = 34 વર્ષ

480. 83, 82, 81 ...... 69, 60, 33

A) 73 B) 80 C) 75 <u>D) 77</u>

481. નીચે આપેલા સમૂહમાંથી કયા અક્ષરો જુદા પડે છે ?

A) સૂર્યમુખીનું તેલ B) કોપરેલ
C) પામ ઓઈલ <u>D) ચંદનના લાકડાનું તેલ</u>

આપેલ સમૂહમાંથી, ચંદનના લાકડાનું તેલ બાકી બધા વિકલ્પ કરતાં અલગ પડે છે.

482. જો TEMPLE ને કોડ ભાષામાં VHQURL લખવામાં આવે છે, તો CHURCH ને કોડ ભાષામાં કેવી રીતે લખાય ?

<u>A) EKYWIO</u> B) EKUWIO C) EKYWIN D) EKYWJO


+2 +3 +4 +5 +6 +7
T E M P L E
↓ ↓ ↓ ↓ ↓ ↓
V H Q U R L

દરેક મૂળાક્ષરને ઉપર પ્રમાણે સંબંધ છે. જેથી,


+2 +3 +4 +5 +6 +7
C H U R C H
↓ ↓ ↓ ↓ ↓ ↓
E K Y W I O

483. સુરેશભાઈ એક વ્યકિતને ઓળખાણ આપે છે કે તે કોઈ સ્ત્રીનો એકમાત્ર પુત્ર છે કે જે મારી માતાના પતિની માં છે.તો સુરેશ તે વ્યકિત સાથે કયો સંબંધ ધરાવે છે ?

A) કાકા <u>B) પુત્ર</u> C) પિતરાઈ D) પિતા




484. નીચે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તે શોધો.



A) 10 <u>B) 15</u> C) 12 D) 17

આપેલ આકૃતિમાં કુલ (10+3+2 = 15) 15 ત્રિકોણ છે.

485. કયો આંકડો 1ની વિરુદ્ધમાં છે ?



A) 6 B) 5 C) 4 <u>D) 3</u>

આપેલ આકૃતિને આધારે કહી શકાય કે 1 અંકની વિરુદ્ધ અંક 3 છે.

486.

4

486. નીચે આપેલાં નિષ્કર્ષોમાંથી કયું નિશ્ચિત રૂપથી કથનોના આધારે સાચું છે ?

કથન : બધા ભીખારી ગરીબ છે.

A) જો A એક ભીખારી છે, તો A અગરીબ છે.

B) જો A એક અમીર નથી, તો A એક ભીખારી છે.

C) બધા ગરીબ ભીખારી છે.

D) જો A અમીર છે, તો A એક ભીખારી છે.

કથન : બધા ભીખારી ગરીબ છે

આપેલ કથનના આધારે કહી શકાય કે, જો A એક ભીખારી છે, તો A એ ગરીબ છે.

GSSSB મિકેનિક - 2017

488. પડતર કિંમત + નફો =...............

A) ખોટ B) વેચાણ કિંમત

C) મૂળ કિંમત D) ખોટ

નફો = વે.કિ. - પડતર કિંમત

∴ પડતર કિંમત + નફો = વેચાણ કિંમત

GSSSB સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017

489. એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમનાં ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો.

A) 4 B) 8 C) 12 D) 17

આપેલ માહિતીને આધારે કહી શકાય કે સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા 17 થશે. (5 + 12)

મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017

490. એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજૂરીમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો હોય?

A) 5.4% વધારો B) 5.4% ઘટાડો

C) 4.5% વધારો D) 4.5% ઘટાડો

X = +10% વધારો Y = -5% ઘટાડો

$\%ફેરફાર = X + Y + \frac{XY}{100} = +10 - 5 + \frac{10 \times -5}{100}$

$= +5 - 0.5 = +4.5\%$

મૂળ મજૂરીમાં 4.5% વધારો થશે.

આપેલ માહિતી વાંચીને નીચે પ્રશ્ન ક્રમાંક 491 થી 493 ના જવાબ આપો.

i) A, B, C, D, E, F, G એમ સાત મૂળાક્ષરોને એક લાઈનમાં ગોઠવવાના છે.

ii) E અને F ની વચ્ચે એક મૂળાક્ષર છે. G અને A ની તરત જમણી બાજુ છે.

iii) F ની તરત ડાબીબાજુ B છે.

iv) D અને A ની વચ્ચે એક મૂળાક્ષર છે.

v) D એ G નો પાડોશી નથી.

vi) G અને F ની વચ્ચે બે મૂળાક્ષરો છે.

સમજૂતી :

D C A G E B F

491. A ની ડાબી બાજુએ બીજા ક્રમે કયો મૂળાક્ષર હશે?

A) C B) B C) D D) E

492. આખી લાઈનમાં સૌથી મધ્યમાં કયો મૂળાક્ષર હશે?

A) D B) A C) C D) G

493. લાઈનમાં બન્ને છેડાઓ પર અંતિમસ્થાનો પર કયા મૂળાક્ષરોની જોડ હશે?

A) A-C B) E-G C) D-F D) C-B

DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017

494. 7 + 15 ÷ 3 × 0 = ...

A) 0 B) 7 C) 10 D) 5

$= 7 + 15 \div 3 \times 0$

$= 7 + \frac{15}{3} \times 0 = 7 + 5 \times 0 = 7$

495. હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ?

A) શનિ B) સૂર્ય C) શુક્ર D) પૃથ્વી

496. 28, 42 તથા 70નો ગુ.સા.અ. ....છે.

A) 28 B) 18 C) 7 D) 14

28, 42, 70

14 28

નાના તફાવત 14 વડે ત્રણેય સંખ્યાને ભાગી શકાય છે.

તેથી ગુ.સા.અ. = 14

497. 625 ના 20% ના 20% = ...

A) 25 B) 225 C) 75 D) 125

$= 625 \times \frac{20}{100} \times \frac{20}{100} = 625 \times \frac{1}{5} \times \frac{1}{5}$

$= \frac{125}{5} = 25$

આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017

498. 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ?

A) 3.75 % B) 2.5 % C) 1.25 % D) 7 %

2.8 kg = 2800 gm

$\% = \frac{35}{2800} \times 100 = \frac{35}{28} = 1.25\%$

499. 2.1, 0.1, 0.02, 0.003, 0.0004ની સરાસરી શોધો.

A) 0.44468 B) 0.30851 C) 2.2234 D) 0.03085

સરેરાશ = $\frac{\text{અવલોકનનો સરવાળો}}{\text{અવલોકનની સંખ્યા}}$

$= \frac{2.1 + 0.1 + 0.02 + 0.003 + 0.0004}{5}$

$= \frac{2.2234}{5} = 0.44468$

500. જો 786 નો અર્થ "Study very hard",958 નો અર્થ "Hard work pays" અને 645 નો અર્થ "Study and work" થતો હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ"very"માટે હોય ?

A) 8 B) 6 C) 7 D) None if these

7 8 6 - Study Very Hard

9 5 8 - Hard Work Pays

6 4 5 - Study and Work

Very = 7 થશે.

501. બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય, તો તે સંખ્યા શોધો.

A) 14, 16 B) 21, 24 C) 28, 32 D) 35, 40

સંખ્યા → 7 : 8

↓ ↓

7X 8X

7X + 8X = 45 15X = 45 X=3

7X = 7 × 3 = 21

8X = 8 × 3 = 24

502. એક વાહન 40 કિ.મી./ કલાકની ઝડપે જાય છે, તો 240 મિનિટમાં કેટલું અંતર કાપે ?

A) 16 કિ.મી. B) 360 કિ.મી.

C) 160 કિ.મી. D) 80 કિ.મી.

ઝડપ = 40 કિ.મી/કલાક

અંતર

60 મિનિટ 40 કિ.મી. $= \frac{240 \times 40}{60}$ = 160 કિ.મી.

240 મિનિટ ?

503. 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ?

A) 120 B) 96 C) 100 D) 88

1, 3, 5, 7, 9 આમ અંકોની સંખ્યા = 5 અંક

આ 5 અંકોનો ઉપયોગ કરી 5 અંકની કુલ સંખ્યા = 5!

5! = 1×2×3×4×5 = 120

504. બે સ્કુટર સમાન અંતર 60 km/hr અને 54 km/hr ની ઝડપે કાપે છે.લાગેલા સમયનો તફાવત 20 મિનિટ છે.અંતર શોધો.

A) 114 km B) 150 km C) 180 km D) 205 km

સમયનો તફાવત = 20 મિનિટ

સમય-1 સમય-2 = 20 મિનિટ

$\frac{\text{અંતર}}{\text{ઝડપ-1}} - \frac{\text{અંતર}}{\text{ઝડપ-2}} = \frac{20}{60}$ કલાક

સમાન અંતર = X લેતાં,

$\frac{X}{54} - \frac{X}{60} = \frac{1}{3}$ $\frac{10X - 9X}{540} = \frac{1}{3}$

$X = \frac{540}{3} = 180$ km

505. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ?

A) 0 B) 1 C) (-1) D) 2

તટસ્થ સંખ્યા,

સરવાળા માટે = 0

ગુણાકાર માટે = 1

506. એક સ્ત્રીએ લગન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું.તો તેણે કુલ કેટલા ગ્રામ સોનું ખરીદ્યું ગણાય ?

A) 128.3018 B) 117.3018 C) 128.2608 D) 127.2618

1 તોલું = 11.6638125 ગ્રામ $= \frac{11 \times 11.6638125}{1}$

11 તોલા = ?

= 128.3018 ગ્રામ

507. એક પાણીની ટાંકીની લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર અને ઉંડાઈ 2 મીટર હોય તો તે ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય?

A) 4000 લીટર B) 400 લીટર

C) 4 લીટર D) 40 લીટર

ટાંકીનું ઘનફળ = લં × પ × ઊં = 2મી × 1મી × 2મી

$= 4\text{મી}^3$

હવે, 1મી^3 = 1000 લિટર $= \frac{4 \times 1000}{1}$ = 4000 લિટર

$4\ \text{મી}^3$ = ?

508. બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેના તફાવત 24 છે.

∴ મોટી સંખ્યા = ...

A) 312 B) 169 C) 144 D) 156

પ્રમાણ 13 : 11

સંખ્યા 13X : 11X

13X-11X = 24 2X = 24 X = 12

તેથી મોટી સંખ્યા = 13X = 13×12 = 156

509. 2 રૂ. 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય ?

A) $5\frac{5}{11}$ B) $3\frac{7}{11}$ C) $3\frac{3}{11}$ D) $7\frac{3}{11}$

2 રૂ. 75 પૈસા = 200 પૈસા + 75 પૈસા = 275 પૈસા


$\% = \frac{10\ \text{પૈસા}}{275\ \text{પૈસા}} \times 100 = \frac{1000}{275} = \frac{40}{11} = 3\frac{7}{11}\%$

GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017

510. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.


2, A, 9, B, 6, C, 13, D,.........

A) 9 B) 10 C) 12 D) 19



GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર - 30/4/2017

511. પ્રશ્નાર્થ (?)વાળા ખાનામાં યોગ્ય જવાબ દર્શાવો.



A) 38 B) 58 C) 27 D) 32

- 7 × 2 = 14, 9 × 2 = 18 — તફાવત = 4
- 2 × 7 = 14, 11 × 8 = 88 — તફાવત = 74
- 8 × 3 = 24, 14 × 4 = 56 — તફાવત = 32

512. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x-1) અને દશકનો અંક (x+1) હોય તો તે સંખ્યા કઈ હશે ?

A) 10x + 10 B) 11x + 11 C) 11x + 10 D) 11x+9

સંખ્યા = 10 × દશક + એકમ = 10 × (X+1)+(X-1)

= 10X + 10 + X - 1 = 11X + 9

513. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય?


A) 3600 B) 30 C) 60 D) 1600

વિકલ્પમાંથી 3600 અને 1600 જ પૂર્ણ વર્ગ સંખ્યા છે.

આ બંન્નેમાંથી માત્ર 3600 ને જ 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય.

514. જો (1)F, Aનો ભાઈ છે. (2) C, Aની દિકરી છે. (3) K, Fની બહેન છે (4) G, Cનો ભાઈ છે. તો Gના કાકા કોણ છે ?

A) A B) C C) F D) K



515. ....નામના ગણિતશાસ્ત્રીએ તાર્કિક રીતે શુદ્ધ ભૂમિતિની રચના કરી જેથી 'ભૂમિતિનું માળખું' તૈયાર થયું.

A) યુક્લીડ B) થેલ્સ C) હિલબર્ટ D) આર્યભટ્ટ

516. 4.8 મી લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી હોય કેટલી ટાઈલ્સ જોઈએ ?

A) 135 B) 150 C) 165 D) 178

4.8મી લંબાઈ અને 3.52મી પહોળાઈનો ગુ.સા.અ. = 0.32મી

$$\text{લાદીઓની સંખ્યા} = \frac{\text{તળીયાનું ક્ષેત્રફળ}}{\text{1 લાદીનું ક્ષેત્રફળ}} = \frac{4.8\times3.52}{0.32\times0.32}$$

$$= \frac{480}{32}\times\frac{352}{32} = 15\times11 = \mathbf{165}$$

517. આપેલ શબ્દોમાંથી જુદા પડતો શબ્દ શોધો.

A) એક્સ રે B) કમ્પ્યૂટર C) ટેલિફોન D) ટેલિવિઝન

એક્સ રે, બાકીના તમામ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ છે.

518. 126°ના માપના ખૂણાના પુરકકોણના કોટિકોણનું માપ કેટલું થાય ?

A) 54° B) 36 C) 63° D) 27°

120°નો પૂરકકોણ = $180^{\circ} - 126^{\circ} = 54^{\circ}$

54°નો કોટિકોણ = $90^{\circ} - 54 = 36^{\circ}$

PI - 2017

519) 1 થી 20 નંબરની ટીકીટમાંથી એક ટીકીટ યથેચ્છ ખેચવામાં આવે તો આ ટીકીટમાંથી ટીકીટનો નંબર 4 અથવા 5 નો ગુણક આવે તેની સંભાવના કેટલી?

(A) $\frac{1}{2}$ (B) $\frac{2}{5}$ (C) $\frac{3}{5}$ (D) $\frac{9}{20}$

4 ના ગુણક 4, 8, 12, 16, 20 છે અને 5 ના ગુણક 5, 10, 15, 20 થાય છે આમ કુલ 8 નંબર મળી શકે છે.

$\therefore$ સંભાવના $= \frac{\text{નંબર}}{\text{કુલ નંબર}} = \frac{8}{20} = \frac{2}{5}$

$\therefore$ **સંભાવના** $= \frac{2}{5}$

520) A8Z, G27T, M64N, ?, Y216B, માં ખુટતું પદ શોધો.

(A) R128J (B) S125H

(C) 5128H (D) એકપણ નહી

પ્રથમ અક્ષર : $A \xrightarrow{+6} G \xrightarrow{+6} M \xrightarrow{+6} S \xrightarrow{+6} Y$

અંતિમ અક્ષર : $Z \xrightarrow{-6} T \xrightarrow{-6} N \xrightarrow{-6} H \xrightarrow{-6} B$

સંખ્યા : $2^3 \rightarrow 3^3 \rightarrow 4^3 \rightarrow 5^3 \rightarrow 6^3$

521) y ની કિંમત શોધવા કયા વિધાનો પર્યાપ્ત છે ?

1. $2x + 3y = 0$ 2. $3x + 9y = 0$

(A) 1 (B) 1,2

(C) 2 (D) બંને અપર્યાપ્ત છે.

522) જો COMPUTER ને RFUVQNPC લખાય તો આજ ભાષામાં MEDICINE કઇ રીતે લખશે?

(A) EOJJDEFM (B) EOJDJEFM

(C) EOJDEJFM (D) EOJDDJFM

પ્રથમ અને છેલ્લો શબ્દના સ્થાન ઉલ્ટાવીને બાકીના બધા તે જ રીતે +1 કરીને લખતા.

523) સંખ્યા 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા મળે ?

(A) 40 (B) 50 (C) 60 (D) એક પણ નહી

$4320 = 2^3 \times 2^2 \times 3^3 \times 5$ પરથી કહી શકાય કે

$2 \times 5^2 = 50$ વડે ગુણવાથી પુર્ણઘન સંખ્યા મળે

524) બે પાસા એક સાથે ફેકવામાં આવે છે તે પૈકી એક પાસા પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી?

(A) $\frac{2}{3}$ (B) $\frac{1}{2}$ (C) $\frac{17}{36}$ D) એક પણ નહી

→ અવિભાજ્ય સંખ્યા 2,3,5 તેથી

સંભાવના $= \frac{3}{6} = \frac{1}{2}$

525) બે સ્ટેશન A, B વચ્ચે અંતર 778 km છે. A થી B ની યાત્રા 84 km/m ની ઝડપે અને B થી A ની યાત્રા 56 km/m ની ઝડપે કરે છે તોસમગ્ર યાત્રા દરમીયાન સરેરાશ ઝડપ કેટલી ?

3, 7, 23, 98,.........

(A) 63.2 km/m (B) 65.2 km/m

(C) 67.2 km/m (D) એક પણ નહી

સરેરાશ ઝડપ $\frac{2(56)\cdot(84)}{56+84}$

સરેરાશ ઝડપ $= \mathbf{67.2}\ km/m$

526) એક વિદ્યાર્થીના સમુહમાં દરેક વિદ્યાર્થી પાસેથી સમુહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે અને કુલ ફાળો 6241 રૂ. થાય છે. તો કેટલા સભ્યો હશે ?

(A) 59 (B) 69 (C) 79 (D) 81

ફાળો $= \frac{\text{કુલ રૂ.}}{\text{સંખ્યા}}$

$x = \frac{6241}{x}$

$x^2 = 6241$

$\therefore x = 79$

527) બે સંખ્યાનો ગુણોતર 3:4 અને ગુ.સા.અ. 4 છે તો તેનો લ.સા.ઓ.શોધો.

(A) 48 (B) 42 (C) 24 (D) 36

ધારો કે બે સંખ્યા $3x$, અને $4x$ છે તો ગુ.સા.અ. $x=4$ આપેલ છે તેથી તે સંખ્યા $3 \times 4 = 12$ અને બીજી સંખ્યા $4 \times 4 = 16$ થશે

$\therefore$ લ.સા.અ. $4 \times 4 \times 3 = 48$ થાય

528) 3:40 કલાકે મિનિટ કાંટા અને કલાક કાટા વચ્ચેનો ખૂણો કેટલો હશે

(A) 120 <u>(B)</u> 130 (C) 140 (D) 150

ખૂણો= $\left|30\,\text{કલાક} - \frac{11}{2}\,\text{મિનિટ}\right| = \left|30(3) - \frac{11}{2}(40)\right| = 130$

529) કયુ વર્ષ લીપ વર્ષ નથી?

(A) 844 (B) 1200

<u>(C)</u> 1700 (D) 200

અહીં 1700, 400 વડે વિભાજ્ય નથી તેથી તે લીપ વર્ષ નથી.

530) $\left(\sqrt{3}+\frac{1}{\sqrt{3}}\right)^2$ કિંમત શોધો.

(A) $16/\sqrt{3}$ (B) $16\sqrt{3}$

<u>(C)</u> $16/3$ (D) એક પણ નહી.

$\left(\sqrt{3}+\frac{1}{\sqrt{3}}\right)^2 = \left(\frac{\sqrt{3}\cdot\sqrt{3}+1}{\sqrt{3}}\right)^2 = \left(\frac{3+1}{\sqrt{3}}\right)^2 = 16/3$

531) એક સંકેતીક ભાષામાં CAT=57 અને SOME = 56 છે તો MATHS ની કિંમત કેટલી થશે ?

(A) 70 (B) 77

(C) 55 <u>(D)</u> એક પણ નહી

→ કોઇ કોડ સેટ થતો નથી તેથી d

532) એક માણસને 12 km નું અંતર 45 મિનિટમાં કાપવાનુ છે જો એક તૃતીયાંશ અંતર બે તૃતીયાંશ સમયમાં કાપે તો બાકીનું અંતર કાપવા માટે કેટલી ઝડપ રાખવી પડશે ?

(A) 28 km/m <u>(B)</u> 32 km/m

(C) 42 km/m (D) 36 km/m

→ $12\times\frac{1}{3} = 4km$ અંતર, $45\times\frac{2}{3} = 30\min$ સમય

∴ બાકી રહેલુ અંતર 8 km અને બાકી રહેલો સમય 15 min

ઝડપ $= \frac{8km}{15/60} = \frac{8\times60}{15} = 32\,km/m$

533) એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ રૂ. 2544 હોય તો તે રકમ શોધો.

<u>(A)</u> 10,000 રૂ. (B) 12,000 રૂ.

(C) 12,500 રૂ. (D) 15,000 રૂ.

→ ચ.વૃ.વ્યાજ $p\left[\left(1+\frac{1}{100}\right)^2-1\right]$

$2544 = p\left[\left(1+\frac{12}{100}\right)^2-1\right]$

$2544 = p\left[\frac{12544-10000}{10000}\right]$

∴ P=10,000 રૂ.

PSI- નશાબંધી

534) D,G,K,N,R,- હારમાં પછીના ક્રમે કયો અક્ષર આવે?

<u>(A)</u> U (B) T (C) S (D) Y

$D \xrightarrow{+3} G \xrightarrow{+4} K \xrightarrow{+3} N \xrightarrow{+4} R \xrightarrow{+3} U$

535) 400 રૂ. માં ખરીદેલ વસ્તુ કઇ કિંમતે વેચવાથી $3\frac{1}{2}\%$ ખોટ જાય?

(A) 414 રૂ. (B) 403.5 રૂ.

(C) 396.50 રૂ. <u>(D)</u> 386 રૂ.

મૂ. કિ.	વે.કિ.
100 રૂ.	96.5
400 રૂ.	?

$\frac{400\times96.5}{100} = 386$ રૂ.

536) 3,8,7, a, 4 અને 9 નો મધ્યક 6 હોય તો a ની કિંમત શોધો.

(A) 7 (B) 6 <u>(C)</u> 5 (D) એક પણ નહિ

$6 = \frac{3+8+7+a+4+9}{6}$

$36 = a + 22 + 9$ ∴ $a=5$

537) $Kx^2+3x-4=0$ નો એક ઉકેલ $x=2$ હોય તો k=___

(A) $1/2$ (B) $-\frac{1}{2}$ (C) 2 (D) -2

$k(2)^2+3(2)-4=0$

$4k+6-4=0$

∴ $k = -1/2$

આંકડાકીય અધિકારી વર્ગ-2(2-7-2000)

538) $1 \times 0.1 \times 0.01 =$ ____

(A) 1.001 (B) 0.0001

<u>(C)</u> 0.001 (D) 1.01

$$1 \times 0.1 \times 0.01 = 1 \times \frac{1}{10} \times \frac{1}{100}$$

$$= \frac{1}{1000}$$

$$= 0.001$$

539) 2.0999 માં કેટલા ઉમેરવાથી સરવાળો 3 થાય?

<u>(A)</u> 0.9001 (B) 1.0001

(C) 0.001 (D) 0.009

તેથી $x = 3.0000 - 2.0999 = 0.9001$

540) $1 + 1 \div 0.1 =$ ______

(A) 20 <u>(B) 11</u> (C) 2 (D) 1.5

→ $1 + 1 \times \frac{1}{0.1} = 1 + 1 \times \frac{1}{1/10} = 1 + 1 \times 10 = 11$

541) 16 અને 25 નું પ્રમાણપદ કેટલુ થાય ?

(A) 4 (B) 01 <u>(C)</u> 20 (D) 14.5

પ્રમાણપદ $= \sqrt{16 \times 25} = 4 \times 5 = 20$

542) 40.5% ને અપૂર્ણાકમાં દર્શાવો

(A) 0.4050 (B) 4.05

<u>(C)</u> 0.405 (D) 0.0405

→ $40.5\% = \frac{40.5}{100} = 0.405$

543) $\frac{G}{T}, \frac{J}{S}, \frac{M}{R}, \frac{P}{Q}$ ____

<u>(A)</u> $\frac{S}{P}$ (B) $\frac{V}{O}$ <u>(C)</u> $\frac{S}{R}$ (D) $\frac{V}{M}$

$G \xrightarrow{+3} J \xrightarrow{+3} M \xrightarrow{+3} P \xrightarrow{+3} S$

$T \xrightarrow{-1} S \xrightarrow{-1} R \xrightarrow{-1} Q \xrightarrow{-1} P$

544) અશોક એક કામ 20 દિવસ અને બકુલ આજકામ 30 દિવસમાં પુરુ કરે છે તો બન્ને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પુરુ કરશે?

<u>(A)</u> 12 (B) 25 (C) 5 (D) 10

$$D = \frac{x \cdot y}{x + y} = \frac{20 \times 30}{30 + 20} = \frac{600}{50} = 12$$

545) $x^{10} \times 0^{10} \times 10^{10} \times 1^{10}$ ની કિંમત શોધો.

(A) 10 (B) 1 <u>(C)</u> 0 (D) અનિશ્ચિત

→ $0^{10} = 0$ તેથી ગમે એટલી સંખ્યા 0 સાથે ગુણાવતા જવાબ 0 આવે

546) બે સંખ્યાને લ.સા.અ. 80 ગુ.સા.અ. 15 છે અને એક રકમ 40 છે તો બીજી રકમ ......હશે.

(A) 15 (B) 8 <u>(C)</u> 30 (D) 47.5

લ.સા.અ. × ગુ.સા.અ. $= a \times b$

$80 \times 15 = 40 \times b$

$$\therefore b = \frac{80 \times 15}{40} = 30$$

547) કયો અપુર્ણાક 17/50 થી નાનો છે ?

<u>(A)</u> 3/5 (B) 11/25 (C) 3/10 (D) 9/20

છેદ સરખો કરતા $\frac{3 \times 10}{5 \times 10} = \frac{30}{50}, \frac{11 \times 2}{25 \times 2} = \frac{22}{50}$

$\frac{3 \times 5}{5 \times 10} = \frac{15}{50}$ જે નાની છે.

નોંધ : છેદ સરખા હોવાથી માત્ર અંશ ધ્યાનમાં લેવા.

548) બે રકમનો સરવાળો 59 અને તફાવત 19 છે, ત ઓ રકમનો ગુણાકાર કેટલો થાય ?

(A) 680 (B) 975 <u>(C)</u> 780 (D) 1121

→ ધારો કે બે રકમ x અને y છે

સરવાળો $x + y = 59$ અને

તફાવત (બાદબાકી) $x - y = 19$ છે તેથી

$x + y = 59$ $39 + y = 59$

$x - y = 19$ $\therefore y = 59 - 39$

$2x = 79$ $\therefore y = 20$

$x = 39$

હવે આ બન્નેનો ગુણાકાર $= 20 \times 39 = 780$

549) જો $\sqrt{6} = 2.45$ હોય $\sqrt{\frac{2}{3}} = ?$

(A) 1.225 (B) 4.9

(C) 0.0018 <u>(D)</u> 0.817

$$\sqrt{\frac{2}{3}} = \frac{\sqrt{2}}{\sqrt{3}} \times \frac{\sqrt{3}}{\sqrt{3}} = \frac{\sqrt{6}}{3} = \frac{2.45}{3} = 0.817$$

550) જો 1 થી 10 સુધીના દરેક અંકમાં 4 ઉમેરવામાં આવે તો આ આંકડાની સરાસરી કિંમત કેટલી થાય ?

(A) 55 (B) 59 <u>(C)</u> 5.5 (D) 9.5

સરાસરી $= \frac{\text{સરવાળો}}{\text{કુલ સંખ્યા}} = \frac{1+2+3+...+10}{10} = \frac{55}{10} = 5.5$

4 ઉમેરતા સરેરાશ $= 5.5 + 4 = 9.5$

551) 200 ના 40% + 150 ના 30% કેટલા થાય?

(A) 125 (B) 130 (C) 135 (D) 145

$$\frac{200\times40}{100}+\frac{150\times30}{100}=80+45=125$$

552) રોમના લીપીમાં 14 નો અંક કેવી રીતે લખાય છે?

(A) XV (B) XIV

(C) XVI (D) IVX

X=10, 4=IV તેથી 14=XIV

553) 25 રૂ.ના 4% એટલે કેટલા થાય?

(A) 75 પૈસા (B) 1રૂ. 25 પૈસા

(C) 1 રૂ. (D) 1 રૂ. 50 પૈસા

25 રૂ. ના $4\% = 25\times\frac{4}{100} = 1$ રૂ.

554) 8, 12, અને 16 ...શ્રેણીનું 7 મુ પદ જણાવો.

(A) 32 (B) 28 (C) 24 (D) 36

$T_n = a + (n-1).d$	$a = 8$ પ્રથમ પદ
$T_7 = 8 + (7-1).4$	d= 12 – 8 = 4 તફાવત
= 8+(7-1) .4	n = 7 મુ પદ
= 8+ 24= 32	
$T_7 = 32$	

આયુર્વેદીક ડોક્ટર વર્ગ - 2 (2000)

555) એક મોટર સાયકલની કિંમત 20% ઘટાડવામાં આવે છે તો નવો ભાવ કેટલા ટકા વધારવામાં આવે કે જેથી કિંમત પહેલા જેટલી થઇ જાય?

(A) 15% (B) 20% (C) 25% (D) 30%

$$\% \text{ વધારો} = \frac{r}{100-r}\times100 = \frac{20}{100-20}\times100$$

$$= \frac{2000}{80} = 25\%$$

556) 0.0036 નું વર્ગમૂળ શું થાય ?

(A) 0.6 (B) 0.06 (C) 0.006 (D) 0.36

→ $\frac{36}{10,000}$ નું વર્ગમૂળ $\frac{6}{100} = 0.06$ થાય

557) હાલમાં પિતાની ઉમર પુત્ર કરતા ચાર ગણી છે. પાંચ વર્ષ પછી તે ત્રણ ગણી થશે તે પુત્રની હાલની ઉમર કેટલી હશે ?

(A) 10 વર્ષ (B) 15 વર્ષ (C) 20 વર્ષ(D) 25 વર્ષ

→હાલમાં પિતા =4 પુત્ર ....(1)

5 વર્ષ પછી પિતા+5=(પુત્ર+5) × 3

પિતા+5=3 પૂત્ર +15

→ પિતા =3 પુત્ર +10........ (2)

સમી 1 માંથી પિતા=4 પુત્ર મુકતા

મુકતા 4 પુત્ર =3 પુત્ર +10

∴ **પુત્ર =10**

558) એક રકમને સાત વડે ગુણીને 5 બાદ કરતા આવતી રકમને ત્રણ વડે ભાગતા 17 મળે છે તો તે રકમ કઇ ?

(A) 7 (B) 8 (C) 9 (D) 13

→ ધારો કે એક રકમ = x છે તો 7 વડે ગુણીને 5 બાદ કરતા

$\frac{x7-5}{3}=17$ તેથી $7x-5=51$

$\therefore 7x=56$ થાય છે

$\therefore x=8$

559) 125 ના 40% ના 40 ટકા કેટલા થાય ?

(A) 20 (B) 30 (C) 40 (D) 50

$$125\times\frac{40}{100}\times\frac{40}{100}=20$$

બોઇલર નિરીક્ષક વર્ગ -2 (2000)

560) જો A=1, PAT= 37 હોય તો TAP=?

(A) 73 (B) 37 (C) 36 (D) 38

→ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં A=1 થી આગળ વધતા T=20 થાય તે મુજબ P+A+T=16+1+20=37 તે જ રીતે TAP માટે T+A+P=20+1+16=37

561) નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે.

(A) $\frac{3}{5}$ (B) $\frac{1}{3}$ (C) $\frac{6}{20}$ (D) $\frac{1}{8}$

→ 5, 3, 20, 8 છેદનો લ.સા.અ. =120 આવે છે. તેથી છેદ સરખા કરતા

$$\frac{3\times24}{5\times24}=\frac{72}{120}, \frac{40\times1}{3\times40}=\frac{40}{120}, \frac{6\times6}{20\times6}$$

$$\frac{36}{120}, \frac{1\times15}{8\times15}=\frac{15}{120}$$

હવે, માત્ર અંશ જોવા જેથી $\frac{3}{5}$ મોટો છે.

562) એક સાયકલના પૈડાનો વ્યાસ 28 cm છે. 0.44 Km નું અંતર કાપવા માટે કેટલા આંટા ફરશે?

(A) 250 (B) 500 (C) 150 (D) 300

એક આંટા દ્વારા કપાતુ અંતર = પરીઘ

$2\pi r = \pi d \frac{22}{7} \times 28 = 88cm$

1 આંટા દ્વારા અંતર =88 cm છે તો 44000 cm અંતર કાપતા...	$\frac{44000}{88} = 500$ આંટા

563) $\sqrt{64 \times 729} - \sqrt[3]{64 \times 729} =$ ____

(A) 180 (B) 120 (C) 252 (D) 150

$\left[(8)^2 \times (27)^2\right]^{1/2} - \left[(4)^3 \times (9)^3\right]^{\frac{1}{3}}$

$= 8 \times 27 - 4 \times 9$

$= 216 - 36 = 180$

ચીફ ઓફિસર વર્ગ – 2,3 (1999)

564) ક્રમમાં કયો અંક આવશે ? 125, 64, 27, 8, ____

(A) 4 (B) 9 (C) 2 (D) 1

$5^3 \xrightarrow{-1} 4^3 \xrightarrow{-1} 3^3 \xrightarrow{-1} 2^3 \xrightarrow{-1} 1^3 = 1$

565) 5, 6, 10, 19, ____

(A) 23 (B) 35 (C) 25 (D) 16

$5 \xrightarrow{+1^2} 6 \xrightarrow{+2^2} 10 \xrightarrow{+3^2} 19 \xrightarrow{+4^2} 35$

566) 1, 1, 2, 4, 3, ____

(A) 5 (B) 6 (C) 9 (D) 8

$1, 1^2, 2, 2^2, 3, 3^2 = 9$

567) 11, 15, 20, 26, 33, ____

(A) 39 (B) 40 (C) 36 (D) 41

$11 \xrightarrow{+4} 15 \xrightarrow{+5} 20 \xrightarrow{+6} 26 \xrightarrow{+7} 33 \xrightarrow{+8} 41$

568) 0, 7, 26, 63, 124 ____

(A) 256 (B) 195 (C) 125 (D) 215

7+12 19+18 37+24 61+30

$0 \xrightarrow{7} 7 \xrightarrow{19} 26 \xrightarrow{37} 63 \xrightarrow{61} 124 \xrightarrow{91} 215$

569) 1 થી 36 સુધીના અંકોનો સરવાળો....થાય.

(A) 360 (B) 666 (C) 720 (D) 540

સરવાળાનું સુત્ર $= S_n = \frac{n}{2}(n+1) = \frac{36 \times 37}{2} = 666$

570) 1 થી 12 સુધીના કુલ અંકોનો સરવાળાની સરેરાશ.....થાય.

(A) 6.5 (B) 6 (C) 72 (D) 78

સરેરાશ = $\frac{\text{સરવાળો}}{\text{સંખ્યા}} = \frac{\text{શોર્ટકટ સુત્ર}}{\text{સંખ્યા}} = \frac{12 \times 13}{2 \times 12} = 6.5$

571) $16 : x :: x : 9$ જ્યાં $x =$ ____

(A) 12 (B) 4 (C) 3 (D) 7

$16 : x :: x : 9$ ને $x^2 = 16 \times 9$ લખાય તેથી

$x^2 = 144$ થાય તેથી $x = 12$

572) $\frac{b}{a} = \frac{1}{2}$ છે તો $\frac{a-b}{a+b} =$ ____

(A) $2/3$ (B) $1/3$ (C) 1 (D) $4/3$

$\frac{a-b}{a+b} = \frac{2-1}{2+1} = \frac{1}{3}$

573) બે રકમનો લ.સા.અ. 840, ગુ.સા.અ. 14 છે તેમાંથી એક સંખ્યા 42 છે તો બીજી સંખ્યા....હશે.

(A) 280 (B) 420 (C) 140 (D) 188

લ.સા.અ. × ગુ.સા.અ. $= a \times b$ મુજબ

$840 \times 14 = 42 \times b$

$\therefore b = \frac{840 \times 14}{42} = 280$

574) 8 ખુરશીની કિંમત =3 ટેબલની કિંમત છે એક ખુરશીની અને 1 ટેબલની કિંમત = 605 રૂ. છે તો ખુરશીની કિંમત કેટલા રૂ. હશે?

(A) 165 (B) 55 (C) 192 (D) 83

8 ખુ. =3 ટે.....(1) 1 ખુ. +1 ટે. =605 3 ખુ.+ 3ટે =1815.... (2)	3 ખુ. =8 ટે સમી. (૧) માંથી (૨)માં મુકતા 11 ખુ. =1815 ∴ 1 ખુ. =165 રૂ.

575) 20 કારીગર એક કામ 25 દિવસમાં પુરુ કરે છે તો 15 કારીગર આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?

(A) 33 (B) 15 (C) 20 (D) 12.5

$\frac{M_1 D_1}{W_1} = \frac{M_2 D_2}{W_2}$ મુજબ

$20 \times 25 = 15 \times D_2 \qquad \therefore D_2 = \frac{20 \times 25}{15} = 33.33$

576) અનીલ એક ઘડિયાળ 10% નફાથી બકુલને અને બકુલ તે ઘડીયાળ 5% નફાથી કમલને વેચેછે જો કમલ આ ઘડિયાળના 462 રૂ. ચુકવતો હોય તો અનીલને આ ઘડિયાળ કેટલા રૂ.માં પડ્યુ હશે?

(A) 250 (B) 240 (C) 320 (D) 400

ધારો કે x રૂ. માં પડ્યુ હતુ તેના પર 10% અને 5% નફો ચડાવતા

$$x\times\frac{110}{100}\times\frac{105}{100}=462$$

$$\therefore x=\frac{462\times100\times100}{110\times105}=400$$

આમ x=400 રૂ. માં પડ્યુ હશે

577) એક વ્યક્તિની 7 દિવસની સરેરાશ કમાણી 25 રૂ. છે અને પ્રથમ 6 દિવસની સરેરાશ કમાણી 23 રૂ. છે. તો સાતમા દિવસની કમાણી કેટલા રૂ. થાય?

(A) 14 (B) 26 (C) 37 (D) 47

7 દિવસની કુલ કમાણી = સરેરાશ x સંખ્યા

25 x 7=175

તેમાંથી 6 દિવસની કુલ કમાણી=23x 6=138

7 મા દીવસની કમાણી =175 -138=37

578) વર્તુળની પરીમીતી અને વ્યાસનો તફાવત 85.6 cm હોય તો આ વર્તુળનું ક્ષેત્રફળ.... ચો. સેમી થાય? (A) 1456 (B) 256 (C) 1256 (D) 20

પરીમીતી-વ્યાસ $2\pi r-2r=2r(3.14-1)=85.6$

$\therefore r\times2(2.14)=85.6$ થાય તેથી

r = 20

તેથી $A=\pi r^2=\frac{314}{100}\times20\times20=1256$

579) લંબચોરસની પરીમીતી 800 મી છે પહોળાઇ 150 મી છે તો લંબચોરસનું ક્ષેત્રફળ.....થાય.

(A) 37500 (B) 3,75,000

(C) 3750 (D) 5100

પરિમીતી $=2(l+b)$	ક્ષેત્રફળ $=l\times b$
$800=2(l+150)$	$=250\times150$
$\therefore 400=l+150$	ક્ષેત્રફળ =37500
$\therefore l=250$	

580) "CARPENTER" ના અંગ્રેજી મૂળાક્ષરો પરથી નીચે પૈકી ક્યો શબ્દ બની શકે નહી.

(A) CARPET (B) PAINTER

(C) REPENT (D) NELTAR

→ PAINTER શબ્દ ન બની શકે કારણ કે તેમાં I શબ્દ આવતો નથી.

581) ABODE માટે સંજ્ઞા EDOBA હોય તો APEX માટેની સંજ્ઞા કઇ હશે ?

(A) PEXA (B) PEXA

(C) XEPA (D) PAEX

→ શબ્દો ઉલ્ટાવીને લખતા XEPA થાય

582) 96, 54, 20,_______

(A) 12 (B) 4 (C) 8 (D) 0

$9\times6=54,\ 5\times4=20,\ 2\times0=0$ થાય

583) $\frac{4}{8}$ નો વ્યસ્ત _______ થાય

(A) 2 (B) $\frac{1}{2}$ (C) $\frac{8}{4}$ (D) $\frac{1}{8}$

→ $\frac{4}{8}$ નો વ્યસ્ત $\frac{8}{4}$ થાય

584) 0.1 = _______

(A) $\frac{10}{1}$ (B) $\frac{1}{10}$ (C) $\frac{1}{100}$ (D) $\frac{1}{1}$

0.1 માટે $0.1=\frac{1}{10}$ લખી શકાય પોઇન્ટની સ્થાનકિંમત છેદમાં મુકવા.

585) એક વર્ષનું 1000 રૂ નું 10% લેખે વ્યાજ શું થાય?

(A) 120 રૂ. (B) 100 રૂ.

(C) 60 રૂ. (D) 10 રૂ.

$I=\frac{PRN}{100}$ મુજબ, $I=\frac{1000\times10\times1}{100}=100$ રૂ.

586) $3\times5\times0=$ _______

(A) 0 (B) 3 (C) 5 (D) 15

કોઇપણ સંખ્યાને 0 બે ગુણતા 0 (શૂન્ય) જ આવે

587) 1 મીટર=_____ મી.મી. થાય.

(A) 10 (B) 100 (C) 1000 (D) 10,000

1 મીટર =100 cm અને 1 cm =10 મીમી થાય તેથી

1 મી = 1000 m.m.

588) નાનામા નાની પ્રાકૃતિક સંખ્યા કઇ છે ?

(A) 0 (B) 2 (C) 1 (D) 10

→ નાનામા નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે.

→ નાનામા નાની અવિભાજ્ય સંખ્યા 2 છે.

589) $1 + 0.1 + 0.01 + 0.001 =$____

(A) 11.1 (B) 11.1 (C) 111.0 <u>(D)</u> 1.111

→ સરવાળો કરતા 1.111 થાય

590) ત્રિકોણના બધા ખૂણાનો સરવાળો કેટલા અંશ થાય?

(A) 45 (B) 90 <u>(C)</u> 180 (D) 360

→ બધા ખુણાનો સરવાળો 180 થાય.

591) ચોરસનું ક્ષેત્રફળ 49 ચો.સે.મી.છે. તો તેની બાજુની લંબાઇ .....સે.મી. હોય.

(A) 3 (B) 5 <u>(C)</u> 7 (D) 9

→ ક્ષેત્રફળ $= l^2$ સુત્ર મુજબ $49 = l^2$ તેથી $l = 7$

કૃષિ અધિકારી વર્ગ-2 (સપ્ટેમ્બર-2001)

592) 25 ની અંદર બે આંકડાની એવી સંખ્યા કઇ છે કે જે અંકોનો સરવાળોએ સંખ્યા કરતા અડધા જેટલો થાય ?

(A) 16 (B) 19 (C) 15 <u>(D)</u> 18

→ બધા અંકોનો સરવાળો કરતા જણાય છે કે માત્ર (d) વિકલ્પમાજ 18 માં 1+8=9 એ મૂળ સંખ્યા 18 થી અડધો છે.

593) 10 ફુટ ચોરસ જમીન ઘાસ નીંદતા એક મજુરને 10 min લાગે છે તો 15 ફુટ ચોરસ જમીનનુ ઘાસ નીંદતા કેટલો સમય લાગશે.

(A) 15 min <u>(B)</u> 22 min 30 sec
(C) 25 min (D) 20 min

10 x 10 માટે 10 min લાગે તો 15x15 ફુટ માટે ત્રિરાશી પરથી

$$\frac{15 \times 15 \times 10}{10 \times 10} = 22.5$$

10 ફુટ ચોરસ જમીન માટે ક્ષેત્ર	= 10x10
150 ફુટ ચોરસ જમીન માટે ક્ષેત્ર	= 15x15

હવે 22.5 એટલે 22 min અને 30 Sec થાય.

594) 1, 8, 27, 64, ____

(A) 111 <u>(B)</u> 125 (C) 625 (D) 125

$1^3, 2^3, 3^3, 4^3, 5^3 = 125$

595) 1, 3, 6, 10, 15, 21, ____

(A) 26 (B) 29 <u>(C)</u> 28 (D) 27

$1 \xrightarrow{+2} 3 \xrightarrow{+3} 6 \xrightarrow{+4} 10 \xrightarrow{+5} 15 \xrightarrow{+6} 21 \xrightarrow{+7} 28$

596) 150 વ્યકિતને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યકિતને કેટલા દિવસ ચાલશે

(A) 10 <u>(B)</u> 9 (C) 8 (D) 7

વ્યકિત દિવસ
150 12 $= \frac{150 \times 12}{200} = 9$ દિવસ
200 ?

લાઇબ્રેરી સહાયક વર્ગ-3 (જુલાઇ-2001)

597) 48, 24, 12, 6, 3, ____

(A) 2.5 <u>(B)</u> 1.5 (C) 2 (D) 1

સંખ્યા અડધી થતી જાય છે તેથી 3 ના અડધા 1.5

598) 3393 માં કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 8 વડે નિ:શેષ ભાગી શકાય?

(A) 2 (B) 4 (C) 6 <u>(D)</u> 7

આપેલ સંખ્યા 3393 ને 8 વડે ભાગતા શેષ 1 મળે છે તેથી 7 ઉમેરતા 3400 થશે તો 8 વડે નિ:શેષ વિભાજ્ય છે તેથી

599) $\sqrt{40}$ ના 36%=______

<u>(A)</u> 2.8 (B) 1.8 (C) 1.2 (D) 33

$$\sqrt{40} \times \frac{36}{100} = 2\sqrt{10} \times \frac{36}{100}$$

$$= 2 \times \frac{3.16 \times 3}{100} = 2.27 \approx 2.8$$

600) $6\frac{1}{2} + 4\frac{1}{4} = 3\frac{1}{4} =$ ____

(A) $7\frac{1}{4}$ <u>(B)</u> $7\frac{1}{2}$ (C) $6\frac{15}{12}$ (D) $6\frac{1}{2}$

$$6\frac{1}{2} + 4\frac{1}{4} - 3\frac{1}{4} = \frac{13}{2} + \frac{17}{4} - \frac{13}{4}$$

$$= \frac{26 + 17 - 13}{4} = \frac{30}{4} = \frac{15}{2} = 7\frac{1}{2}$$

601) વાલમ એટલે PQR અને ગામડી એટલે SRT હોય તો લગામ =_____થાય

(A) QST (B) PSR (C) SRQ <u>(D)</u> QSR

બન્નેમાં 'મ'સામાન્ય અને R સામાન્ય આવે છે તેથી મ =R થશે.

લ=Q અને ગા=S થાય આપેલા શબ્દો પરથી તેથી લગામ = QSR થાય.

602) એક સંખ્યાના 40% બરાબર 72 થતા હોય તો તે સંખ્યાના 60 ટકા બરાબર કેટલા થાય ?

(A) 108 (B) 96 (C) 82 (D) 87

$$x \times \frac{40}{100} = 72 \Rightarrow x = \frac{100 \times 72}{40} = 180$$

હવે આ સંખ્યા $\frac{180 \times 60}{100} = 108$

603) કાટકોણ ત્રિકોણમાં એક બાજુનુ માપ 12 cm અને તેનુ ક્ષેત્રફળ 30 ચો.સેમી. છે તો તે ત્રિકોણની પરીમીતી =_____

(A) 13 cm (B) 13 cm

(C) 30 cm (D) 12 cm

ક્ષેત્રફળ $= \frac{1}{2} \times$ વેધ મુજબ

$30 = \frac{1}{2} \times 12 \times$ વેધ

પાયથાગોરસ ત્રિપુટી મુજબ

વેધ =5

5, 12, 13 થાય તેથી

પરીમીતી = 5+12+13=30

604) AGI, BHJ, CIK, DJL,_____

(A) EKN (B) EKM

(C) EMK (D) ELM

$$A \xrightarrow{+1} B \xrightarrow{+1} C \xrightarrow{+1} D \xrightarrow{+1} E$$

$$G \xrightarrow{+1} H \xrightarrow{+1} I \xrightarrow{+1} J \xrightarrow{+1} K$$

$$I \xrightarrow{+1} J \xrightarrow{+1} K \xrightarrow{+1} L \xrightarrow{+1} M$$

605) $\frac{3-2\times 7+3?}{20-6\div 3+5} = 5$ હોય તો

(A) 7 (B) 9 (C) 23 (D) 42

$$\frac{3-14+3?}{20-2+5} = 5 \qquad 3-14+3\times ? = 115$$

$$\frac{3-14\times 3\times ?}{23} = 5 \qquad 3\times ? = 115-3+14$$

$$? = \frac{126}{3} = 42$$

$$\therefore ? = 42$$

606) $1+(0.1)^2-(0.1)^3$=____

(A) 1 (B) 1.01 (C) 1.09 (D) 1.009

$$1+\left(\frac{1}{10}\right)^2-\left(\frac{1}{10}\right)^3 = 1+\frac{1}{100}-\frac{1}{1000}$$

$$= \frac{1000+10-1}{1000} = \frac{1009}{1000} = 1.009$$

ઉદ્યોગ અધિકારી વર્ગ -2 (2002)

607) 3, 8, 15, 24, 34, 48, 63, અસંગત નંબર......છે.

(A) 15 (B) 24 (C) 34 (D) 48

$$3 \xrightarrow{+5} 8 \xrightarrow{+7} 15 \xrightarrow{+9} 24 \xrightarrow{+11} 35$$

$$\xrightarrow{+13} 48 \xrightarrow{+15} 63$$

608) 512 ના 25% ના 200%=___

(A) 1024 (B) 500 (C) 256 (D) 562

$$512 \times \frac{25}{100} \times \frac{200}{100} = 256$$

609) $(1000)^1$ અને $(1)^{1000}$ વચ્ચે તફાવત કેટલો છે ?

(A) 99 (B) 999 (C) 9999 (D) 0

$1000^1 = 1000$ અને $1^{1000} = 1$

$\therefore 1000 - 1 = 999$

નોંધણી નિરીક્ષક વર્ગ -2 (ઓક્ટોબર -2002)

610) 4, 12, 36, 108, _____

(A) 216 (B) 432 (C) 388 (D) 324

$$4 \xrightarrow{\times 3} 12 \xrightarrow{\times 3} 36 \xrightarrow{\times 3} 108 \xrightarrow{\times 3} 324$$

611) નીચે પૈકી ક્યો વિકલ્પ અલગ પડે છે?

(A) 195 (B) 143 (C) 117 (D) 171

અહી (a) 5 વડે માત્ર વિભાજ્ય છે તેથી a

612) 100, 10, 81, 9, 64,____

(A) 6 (B) 8 (C) 7 (D) 9

$10^2, 10, 9^2, 9, 8^2, \underline{8}$

613) ત્રણ સંખ્યાનું પ્રમાણ 3:4:6 અને તે સંખ્યાનો ગુણાકાર 1944 છે તો સૌથી મોટી સંખ્યા.......છે.

(A) 6 (B) 12 (C) 18 (D) 10

ધારો કે સંખ્યા $3x, 4x, 6x$ છે.

$\therefore 3x \times 4x \times 6x = 1944$

$\therefore 72x^3 = 1944$

તો $x^3 = 27 \Rightarrow x = 3$

$\therefore$ સંખ્યાઓ $= 6x = 6 \times 3 = 18$

614) બે વિષયની પરીક્ષામાં બેઠેલા 120 વિદ્યાર્થીમાંથી 55 વિદ્યાર્થી એકમો અને 60 વિદ્યાર્થી બીજામાં પાસ થાય છે. 22 વિદ્યાર્થી બંન્નેમાં પાસ થાય છે તો કેટલા વિદ્યાર્થી બંનેમાં નાપાસ થાય ?

(A) 27 (B) 37 (C) 97 (D) 130

કોઇ એક અથવા

બે માં પાસ હોય તેવા વિદ્યાર્થી 55 + 60 − 22 = 93

∴ બેઠેલા વિદ્યાર્થી - પાસ થયેલા વિદ્યાર્થી

= 120 − 93 = 27 વિદ્યાર્થી બંન્નેમાં નાપાસ

615) પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય?

(A) 210 (B) 90 (C) 110 (D) 310

સરવાળો $= \frac{20 \times 21}{2} = 210$

616) અનીલને સુનીલ કરતા 10% વધુ મળે છે તો સુનીલને અનીલ કરતા કેટલા ઓછા મળે?

(A) 9 (B) $9\frac{1}{11}$% (C) 10% (D) $9\frac{10}{11}$%

% ઓછા મળે $= \frac{r}{100+r} \times 100$

$= \frac{10}{100+10} \times 100$

$= \frac{1000}{110} = 9\frac{1}{11}\%$

617) ? : MON :: EFG : CED માં ? જગ્યા એ શુ આવે

(A) OPQ (B) PQR (C) OQP (D) OQR

EFG મુજબ OPQ થશે કારણ કે MNO પરથી MON તથા CDE પરથી CED લખ્યુ છે તેથી

618) FOOT : TOES :: HAND : ?

(A) FINGER (B) PALM

(C) THUMB (D) NAIL

પગઃ પગની આંગી :: હાથ : હાથની આંગળી (FINGER)

619) YEAR : MONTH :: Week : ?

(A) Hour (B) Minute

(C) Day (D) Fortnight

વર્ષમાં મહિના = અઠવાડીયામાં દિવસ (Day)

620) 9:25 :: 49 : ?

(A) 63 (B) 36 (C) 64 (D) 81

$3^2 : 5^2 :: 7^2 : 9^2$

621) 18, 10, 6, 4, ?

(A) 8 (B) 6 (C) 3 (D) 15

$18 \xrightarrow{-8} 10 \xrightarrow{-4} 6 \xrightarrow{-2} 4 \xrightarrow{-1} 3$

622) 27, 64, 125, 216, 343, ?

(A) 416 (B) 512 (C) 686 (D) 559

$3^3, 4^3, 5^3, 6^3, 7^3, 8^3 = 512$

623) 17, 13, 11, 7, 5, 1, ?

(A) 1 (B) 2 (C) 0 (D) -1

$17 \xrightarrow{-4} 13 \xrightarrow{-2} 11 \xrightarrow{-4} 7 \xrightarrow{-2} 5 \xrightarrow{-4} 1 \xrightarrow{-2} -1$

624) MIRACULOUSમાંથી કયો શબ્દ બની શકે નહી?

(A) LOCUS (B) SCAR

(C) SOLACE (D) MOLAR

અહી E શબ્દ આપેલા સ્પેલિંગમા આવતો નથી તેથી (C) વિકલ્પનો સ્પેલિંગ બને નહી.

625) BOOK નો કોડ 43 છે તો HATE નો કોડ......થાય.

(A) 38 (B) 32 (C) 34 (D) 37

BOOK = 2+ 15 + 15 + 12=43

HATE = 8+ 1+20+5=34

(અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમનો સરવાળો)

626) PEN = ODM થાય તો WET=____ થાય

(A) UVR (B) TFQ

(C) VDS (D) SHP

$P \xrightarrow{-1} O,\ E \xrightarrow{-1} D,\ N \xrightarrow{-1} M$ મુજબ

$W \xrightarrow{-1} V,\ E \xrightarrow{-1} D,\ T \xrightarrow{-1} S$

627) WORLD = 13456 હોય તો ROW= ____ થાય

(A) 123 (B) 431 (C) 345 (D) 134

આપેલા શબ્દ પરથી W=1, 0=3, અને R=4 છે તેથી ROW = 431

628) 1, 4, ?, 64, 256,

(A) 32 (B) 16 (C) 8 (D) 128

$1^2, 2^2, 4^2, 8^2, 16^2$

629) 25 : x :: x : 4 હોય તો x નું મુલ્ય......થાય.

(A) 2.5 (B) 9 (C) 10 (D) 21

25 : x :: x : 4 છે તો x^2=100 થાય

તેથી $x = 10$

630) 1 થી 15 સુધીના અંકોના સરવાળાની સરેરાશ કિંમત ....છે.

(A) 7.5 (B) 8 (C) 120 (D) 15

$$\text{સરેરાશ} = \frac{\text{સરવાળો}}{\text{સંખ્યા}} = \frac{\frac{15\times16}{2}}{15} = 8$$

631) આકાશ એક પેન ધરતીને 20% નફો ચડાવીને વેચેછે ધરતી આ પેન પર 25% નફો ચડાવીને પાતાળને વેચે છે. પાતાળ આ પેનના 75 રૂ. ચુકવતો હોય તો આકાશને આ પેન કેટલા રૂ. માં પડી હશે?

(A) 100 (B) 50 (C) 80 (D) 55

ધારો કે x રૂ. માં પડી હશે. તેથી

$$x \times \frac{120}{100}\times\frac{125}{100} = 75$$

$$\therefore x = \frac{750000}{125\times120} = 50 \text{ રૂ.}$$

632) નીચે પૈકી કઇ કિંમત સૌથી નાની છે

(A) $\frac{8}{15}$ (B) $\frac{3}{5}$ (C) $\frac{2}{3}$ (D) $\frac{7}{30}$

બધાના છેદ નો લ.સા.અ. 30 છે તેથી

$$\frac{8\times2}{30} = \frac{16}{30}, \quad \frac{3\times6}{5\times6} = \frac{18}{30}$$

$$\frac{2\times10}{3\times10} = \frac{20}{30}, \frac{7}{30}$$

સ્પષ્ટ જણાય છે છેદ સરખા હોવાથી માત્ર અંશ જોતા જે અંશ નાનો તે સૌથી નાની છે તેથી (d)

633) $\frac{b}{a} = \frac{3}{5}$ છે તો $\frac{a-b}{a+b}$ =

(A) $\frac{1}{4}$ (B) $\frac{3}{4}$ (C) $\frac{3}{5}$ (D) $\frac{5}{3}$

b=3 , a=5 મુકતા $\frac{a-b}{a+b} = \frac{5-3}{5+3} = \frac{2}{8} = \frac{1}{4}$

634) રામ ને લક્ષમણ કરતા 10% વધુ મળે છે. તો લક્ષમણ ને રામ કરતા......% મળે.

(A) 10% ઓછા (B) 11% ઓછા

(C) 0% ઓછા (D) 20% ઓછા

$$\therefore \text{ઓછા} = \frac{r}{100+r}\times100$$

$$= \frac{10\times100}{100+10} \quad = \frac{10\times100}{110} = 9.99$$

635) વર્તુળનો વ્યાસ =14 cm છે. તો તેના પરીઘનું માપ ......છે.

(A) 14 cm (B) 3.14 cm

(C) 88 cm (D) 44 cm

$$\text{પરીઘ} = 2\pi r = \pi d = \frac{22}{7}\times14 = 44$$

636) $880 \div 11 + 88 =$ ____

(A) 168 (B) 96 (C) 800 (D) 888

$$\frac{88}{11} + 88 = 80 + 88 = 168$$

637) $(256)^{0.16} \times (256)^{0.09} =$?

(A) 4 (B) 16 (C) 0.25 (D) 256

$$(256)^{0.16}\times(256)^{0.09} = (256)^{0.25} = (256)^{1/4} = 4$$

અભિલેખાગાર વર્ગ-2(2004)

638) 64 નાં વર્ગમૂળનું ઘનમૂળ કેટલું?

(A) 2 (B) 4 (C) 8 (D) એક પણ નહી

64 નું વર્ગમૂળ = 8 નું ઘનમૂળ = 2

639) $\frac{3}{4}$ એટલે કેટલા ટકા ?

(A) 25% (B) 0.75%

(C) 75% (D) 3.4%

$$\frac{3}{4}\times100 = 75\%$$

મેડીકલ ટ્યૂટર-વર્ગ-2(2005)

640) 10 cm વ્યાસ વાળા વર્તુળની ત્રિજ્યા...... થાય.

(A) 5 (B) 20 (C) 100 (D) 25

$\frac{\text{વ્યાસ}}{2}$ = ત્રિજ્યા પરથી ત્રિજ્યા $= \frac{10}{2} = 5$

641) એક કાટકોણ ત્રિકોણનો ખૂણો 45^0 છે તો ત્રીજો ખૂણો કેટલા અંશનો હોય ?

(A) 45 (B) 90 (C) 60 (D) 40

કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90^0 હોય બીજો 45^0 આપેલ છે તે ત્રીજોખુણો 45^0 હોય કારણ કે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180^0 હોય છે.

642) $(3\times2)^2\times0=$ ___

(A) 5 (B) 25 (C) 10 (D) શૂન્ય

કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા શૂન્ય જ આવે.

643) 4, 9, 16, 25, ______

(A) 36 (B) 64 (C) 27 (D) 125

$2^2, 3^2, 4^2, 5^2, 6^2, =36$

644) $xyz^0=$ ____

(A) xy (B) શૂન્ય (C) 1 (D) xyz

$xyz0 = x\cdot y$ કોઈપણ સંખ્યાની ઘાતમાં 0 મુકતા તે 1 થાય.

645) 8^2 નું ઘનમૂળ શુ થાય ?

(A) 8 (B) 4 (C) 64 (D) 2

$8^2=64$ નું ઘનમૂળ =4

646) વર્તુળની મોટામાં મોટી જીવા એટલે?

(A) ત્રિજયા (B) વ્યાસ (C) ચાપ (D) પરીઘ

મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય

647) નળાકારના ઘનફળનું સુત્ર.......છે.

(A) $2\pi rh$ (B) πr^2h

(C) $\pi/3\, r^2h$ (D) $4/3\, \pi r^2h$

નળાકારના ઘનફળનું સુત્ર πr^2h અને વક્રસપાટીનું સુત્ર $=2\pi rh$

648) $(5+5\times15\div5)=$ ___

(A) 10 (B) 20 (C) 30 (D) 40

$5+5\times\frac{15}{5}=5+15=20$

649) સરવાળાની તટસ્થ સંખ્યા.......છે.

(A) 1 (B) 0 (C) 10 (D) એક પણ નહી

650) ગોળાના કદનું સુત્ર.........છે.

(A) 2π ત્રિ. (B) $4/3\,\pi$ ત્રિ.^{3}

(C) 4π ત્રિ.^{2} (D) $\pi\times$ વ્યાસ

651) 7, 11, 10, 14, 13, ____, ____

(A) 17, 16 (B) 17, 18

(C) 12, 16 (D) 17, 17

$7\xrightarrow{+3}10\xrightarrow{+3}13\xrightarrow{+3}16$

$11\xrightarrow{+3}14\xrightarrow{+3}17$

652) રોમન અંકમાં C નો મતલબ.....છે.

(A) 10 (B) 100

(C) 1000 (D) 10,000

C = 100, L=50 અને X=10, V=5

653) કોના વર્ગમુળનું ઘનમુળ 2 છે.

(A) 8 (B) 16 (C) 64 (D) 36

$\sqrt[3]{\sqrt{x}}=2\Rightarrow\sqrt{x}=2^3$

$\sqrt{x}=8\Rightarrow x=8^2=64$

654) ΔABC માં માપ $\angle A=78$ છે તો માપ $\angle B+$ માપ $\angle C=$ કેટલા અંશ થશે?

(A) 78^0 (B) 102 (C) 100 (D) 80

$\angle A+\angle B+\angle C=180$

$78+\angle B+\angle C=180$

$\therefore\angle B+\angle C=180-78=102$

655) 600 રૂ. ની ઘડિયાળ 750 રૂ. માં વેચતા કેટલા ટકા નફો થાય ?

(A) 150% (B) 25% (C) 15% (D) 20%

ટકા નફો $=\frac{\text{નફો(રૂ.)}}{\text{મુ.કિ.}}\times100=\frac{150}{600}\times100=25\%$

656) સમઘનનું પૃષ્ઠફળ શોધવાનુ સુત્ર......છે.

(A) 4 (l) (B) લંબાઇ × પહોળાઇ

(C) 4(લંબાઇ)^2 (D)3 (લંબાઇ)^2 3(પહોળાઇ)^2

સમઘનનું પૃષ્ઠફળ $=4l^2$

657) 100 રૂ.નું 10% લેખે બે વર્ષનું સાદુવ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત....રૂ. થાય.

(A) 30 (B) 20 (C) 1 (D) એક પણ નહી

શોર્ટકટ

$$D=\frac{PR^2}{(100)^2}=\frac{100\times10\times10}{100\times100}=1 \text{ રૂ.}$$

658) એક નળથી ટાંકી 8 કલાકમાં સંપૂર્ણ ભરાઇ જતી હોય તો આ નળથી ¼ ભાગની ટાંકી ભરાતા કેટલી મીનીટ થાય ?

(A) 32 (B) 60 (C) 120 (D) 240

1 ટાંકી ભરાતા 8 કલાક ¼ ટાંકી ભરાતા ?	$\frac{480\,min}{4} = 120\,min$

659) $111\times111\times(111-111) = __$

(A) 111 (B) -111 <u>(C)</u> 0 (D) 1111

(111-111)=0 હોવાથી 0 ને કોઈપણ સંખ્યા વડે ગુણતા 0 જ આવે.

660) પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા આઠગણી છે. જો બન્નેની ઉંમરનો સરવાળો 36 વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી હોય ?

(A) 5 વર્ષ <u>(B)</u> 4 વર્ષ

(C) 9 વર્ષ (D) 6 વર્ષ

પિતા =8 પૂત્ર ...(1)	પિતા + પુત્ર=36.....(2) સમી. (1) માંથી પિતા =8 પૂત્ર 8 પુત્ર + પુત્ર 9 પુત્ર=36 ∴ પુત્ર=4

661) ચતુષ્કોણના બે ખુણાના માપ 115^o અને 45^o છે બાકીના બન્ને ખુણાઓના માપ સરખા છે. તો તેના માપ કયા હશે ?

<u>(A)</u> 100, 100 (B) 80,80

(C) 90, 90 (D) 75, 75

ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો 360 થાય તેમાંથી બે આપ્યા છે અને બાકીના બે સમાન છે તે x ધારતા તેથી

$x+x+115^o+45^o=360$

$\therefore 2x = 360-160 \quad x=100$

662) 37, 43, 40, 46, 43, ?

(A) 59 <u>(B)</u> 49 (C) 47 (D) 59

$37 \xrightarrow{+6} 43 \xrightarrow{-3} 40 \xrightarrow{+6} 46 \xrightarrow{-3} 43 \xrightarrow{+6} 49$

663) 1, 2, 5, 10, 17, 26___

(A) 34 (B) 35 (C) 36 <u>(D)</u> 37

$1 \xrightarrow{+1} 2 \xrightarrow{+3} 5 \xrightarrow{+5} 10 \xrightarrow{+7} 17 \xrightarrow{+9} 26 \xrightarrow{11} 37$

મેડિકલ સેવા, વર્ગ-2-2006

664) $32.05\times15+?=500$

(A) 15.25 (B) 14.75 (C) 17 <u>(D)</u> 19.25

ધારો કે $32.05\times15+x=500$

$\therefore x = 500-480.75 = 19.25$

665) જો + બાદબાકી – ગુણાકારની સંજ્ઞા હોય x ભાગાકારની સંજ્ઞા અને ÷ સરવાળાની સંજ્ઞા હોય તો.... $5-5+5\div5\times5=?$

(A) 4 (B) 5 (C) 6 <u>(D)</u> 21

$5-5+5\div5\times5=?$ તેથી 25 – 5 + 1= 21 થાય

666) 2, 6, 11, 17 ____, 32.

(A) 20 <u>(B)</u> 24 (C) 25 (D) 28

$2 \xrightarrow{+4} 6 \xrightarrow{+5} 11 \xrightarrow{+6} 17 \xrightarrow{+7} 24 \xrightarrow{+8} 32$

મેડિકલટયુટર- વર્ગ-2 એપ્રિલ-2006

667) $|x-1|=8$ હોય તો x ની કિંમત કેટલી ?

(A) 9 (B) -9 અથવા 7

(C) -9 અથવા-7 <u>(D)</u> 9 અથવા -7

$|x-1|=8$ હોય તો $x-1=8$ અથવા $x-1=-8$

તેથી $x=9$ અથવા $x=-7$

668) 560 એ કોના 70% થાય ?

(A) 700 <u>(B)</u> 800 (C) 820 (D) 1120

$560 = x\times\frac{70}{100}$ (x ના 70% 560 છે તેમ ધારતા)

$x=\frac{5600}{7}=800$

મદદનીશ ઇજનેર વર્ગ-2 ફેબ્રુઆરી-2006

669) x અને $4/x$ નો સરવાળો 4 થાય તો x નુ મુલ્ય કેટલુ?

<u>(A)</u> 2 (B) 4 (C) 8 (D) એક પણ નહી

$x+4/x=4$ તો $x^2+4=4x$

$\therefore x^2-4x+4=0$ ના અવયવ પાડતા

$(x-2)^2=0 \Rightarrow x=2$

670) GIRL ને FHQK સાંકેતીક ભાષામાં લખી શકાય છે તો તેજ સાંકેતીક ભાષામાં WOMEN કેવી રીતે લખી શકાય ?

<u>(A)</u> VNLDM (B) FHQKN

(C) XPNFO (D) VLNDM

$G\xrightarrow{-1}F, I\xrightarrow{-1}H, R\xrightarrow{-1}Q, L\xrightarrow{-1}K$ મુજબ

$W\xrightarrow{-1}V, O\xrightarrow{-1}N, M\xrightarrow{-1}L, E\xrightarrow{-1}D, N\xrightarrow{-18}M$

671) એક વેપારી એક ટેબલ રૂ. 480 માં વેચે તો 20% ખોટ જાય છે જો તેને 20% નફાથી મેળવવો હોય તો તે ટેબલ કેટલા રૂ. માં વેચવું જોઇએ?

(A) 520 રૂ. (B) 720 રૂ.

(C) 600 રૂ. (D) 800 રૂ.

→ અહી 20% ખોટ જાય છે તો 80% = 480 રૂ. થાય તો 20% નફા સાથે 120 % = ? રૂ.

$\frac{120 \times 480}{80} = 720$ રૂ.

672) એક પેટીમાં 3 સફેદ 4 રાતા દડા છે તેમાંથી બે દડા લેવામાં આવે તો બન્ને દડા લાલ હોવાની સંભાવના કેટલી ?

(A) 1/7 (B) 2/7 (C) 3/7 (D) 4/7

→બન્ને લાલ આવે તેની સંભાવના $= \frac{\text{સંખ્યા}}{\text{કુલ સંખ્યા}} = \frac{4}{7}$

GPSC સિવિલ સર્વિસ ક્લાસ -1,2 (2007)

673) SATISFACTION શબ્દ પરથી કયો શબ્દ નથી બનતો.

(A) FAST (B) ACTION

(C) NATION (D) STATION

→ C વિકલ્પ N બેવાર આવતું હોવાથી આપેલા શબ્દ પરથી NATION શબ્દ ન બને

674) 1મિલીયન એટલે શું થાય ?

(A) એક કરોડ (B) પચાસ લાખ

(C) એક લાખ (D) દસ લાખ

→ 1 મીલીયન = દસલાખ

1 બીલીયન = સો કરોડ

675) $\frac{1}{8}$ એટલે કેટલા ટકા ?

(A) 15 (B) 25 (C) 12.5 (D) 20

$\frac{1}{8} \times 100\% = 12.5\%$

નાયબ નિયામક વર્ગ -2 (2007)

676) 35....38....42....47....?

(A) 52 (B) 53 (C) 54 (D) 55

$35 \xrightarrow{+3} 38 \xrightarrow{+4} 42 \xrightarrow{+5} 47 \xrightarrow{+6} 53$

677) AD, DI, IR, RI, ?

(A) IP (B) JX (C) DP (D) PT

$A \xrightarrow{+3} D \xrightarrow{3+2=5} I \xrightarrow{5+4=9} R \xrightarrow{2+8=17} I \xrightarrow{17+16=33} P$

AD DI IR RI IP

678) એક સાઇકલ સવાર તરફ ઇશારો કરતા કરણે કહ્યું ને મારા દાદાના એકમાત્ર પુત્રની પુત્રી છે. તો તેની સાથે કરણનો શું સગપણ હશે ?

(A) માતા-પુત્ર (B) ભાઇ-બહેન

(C) ફોઇ-ભત્રીજા (D) પિતરાઇ ભાઇ

→ દાદાનો એક માત્ર પુત્ર એટલે તેના પિતા પોતે તેની દિકરી કરણની બહેન થાય.

679)એક સાંકેતીક ભાષામાં COMPUTER ને MCOTPUER LIGHT ને GLITHT કહેવાનું હોય તો WONDER ને શું કહેવાશે?

(A) NOWRDE (B) NWORDE

(C) NOWDER (D) NOWERD

→ COMPUTER માં COM ને MCO. તેજ રીતે PUT ને TPU અને ER ને ER લખાય છે તો તેજ રીતે LIGHT માં LIG ને GLI અને T ને HT લખતા WONDER માં WON ને NOW અને DER ને RDE લખતા WONDER ને NOWDER લખાય

680) કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત જળવાશે.

(A) BDPYKDB (B) PULKMUP

(C) AOVIVOA (D) RANTDAR

→ સ્પષ્ટ છે કે AOVIVOA એક માત્ર એવો શબ્દ છે કે જેને બાજુમાં અરીસા સામે ધરતા પાર્શ્વીય વ્યુતક્રમણ થવાથી કોઇ ફરક પડશે નહી.

એકાઉન્ટ ઓડિટર -12-6-2016

681) પડતર કિંમત + નફો =____

(A) ખોટ (B) વેચાણ કિંમત

(C) ખોટ (D) મુળકિંમત

નફો = વે.કિ. - પ.કિ. પરથી

<u>પ.કિ. + નફો = વે.કિ.</u>

682) નીચે આપેલી સંખ્યાની સરાસરી જણાવો

112, 122, 132, 152, 302

(A) 163 (B) 165

(C) 174 (D) એક પણ નહી

સરાસરી $= \frac{112+122+132+152+302}{5} = \frac{820}{5} = 164$

683) પ્રથમ પાંચ પ્રાકૃતિક સખ્યાઓની સરાસરી....

(A) 2 (B) 5 (C) 3 (D) 6

→ $\frac{\text{સરવાળો}}{\text{સંખ્યા}} =$ સરેરાશ

∵ સરેરાશ $= \frac{5\times6}{2\times5} = 3$

684) દસ લાખ એટલે કેટલા મિલિયન ?

(A) 1 (B) 2 (C) 10 (D) 20

→ 1 મીલીયન =10લાખ

1 બીલીયન = 100 કરોડ

685) $9x^2+4y^2=145$ અને $x\cdot y=12$ હોય તો $(3x-2y)$ ની કિંમત કેટલી?

(A) 1 (B) 12 (C) 11 (D) 7

→ દાખલો ગણતરી વગર ગણી શકાય છે જે અંક x, y નો ગુણાકાર 12 છે તો 12 ના એકમાત્ર 4, 3 અવયવ એવા છે જે $9x^2+4y^2 = 9(3)^2+4(4)^2 = 145$ નું સમાધાન કરે છે તેથી $x=3,\ y=4$ હોય તો $3x-2y=3(3)-2(4)=9-8=1$

686) અમીતને તેના પિતાએ આપેલ રકમમાંથી 20% રકમના પુસ્તકો, 25% રકમની નોટબુક, કંપાસ અને 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલ રકમ રૂ. 1350 તેના પીતાને પરત કરી.તેના પિતાએ કેટલી રકમ આપી?

(A) 2500 (B) 2800 (C) 3000 (D) 3200

$\frac{x20}{100}+\frac{25x}{100}+\frac{10x}{100}+1350=x$

$\frac{55x}{100}=x-1350$	$55x=100x-135000$ $\therefore 45x=135000$ $x=\frac{135000}{45}$ $\therefore x=3000$

687) એક પરીક્ષામાં 5% ઉમેદવાર ગેરહાજર અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થાય. જો 9690 ઉમેરદવારો પાસ થાય તો કુલ ઉમેદવાર કેટલા હતા?

(A) 11500 (B) 12000

(C) 12500 (D) 12800

→ 15% નાપાસ થાય તેથી 85% પાસ થાય જે 9690 જેટલા છે. તેથી

85% = 9690 ઉમેદવાર 100% =?	$\frac{9690\times100}{85}=11400$

આમ 11400 ઉમેદવારોએ પરીક્ષા આપી છે જે 95% વિધાર્થી છે કારણ કે 5% ઉમેદવારો ગેરહાજર છે.

95% વિધાર્થી =11400 100% =?	$\frac{100\times11400}{95}=12000$ પરીક્ષા આપનાર

688) ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરતા ગોળાના ઘનફળમાં ____ % વધારો થાય.

(A) 10 (B) 21 (C) 33.1 (D) 27.1

→ ગોળાની ત્રિજ્યા 1 હોય તો ઘનફળ, $v=\frac{4}{3}\pi$ થશે

જો ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરતા ત્રિજ્યામાં 0.1 વધારો થતા નવી ત્રિજ્યા 1.1 થશે તેથી ઘનફળ

ઘનફળ $=\frac{4}{3}\pi(1.1)^3=\frac{4}{3}\pi(1.331)$ થશે

તેથી ઘનફળમાં 0.331 વધારો થાય છે તેને ટકામાં ફેરવતા $0.331\times100=33.1\%$ થશે.

689) 100 ચો.મી.ના ચોરસ ફુટ કેટલા થાય ?

(A) 1132 (B) 1076 (C) 1090 (D) 1176

→ યાદ રાખો 100 ચો.મી. = 1076. 39104 ચો.ફુટ

1 ચો.મી. =10.76 ચો.ફુટ

690) π અને $\frac{22}{7}$ માં.....

(A) π અને $\frac{22}{7}$ બન્નેં સંમેય સંખ્યા છે.

(B) π અને $\frac{22}{7}$ બન્ને અસંમેય સંખ્યા છે.

(C) π અસંમેય અને $\frac{22}{7}$ સંમેય સંખ્યા છે.

(D) π સંમેય અને $\frac{22}{7}$ અસંમેય સંખ્યા છે.

→ યાદ રાખવુ કે π અસંમેય છે કા.કે તે અનંત અનાવૃત છે તેથી અને $\frac{22}{7}$ સંમેય છે જે $\frac{P}{q}$ સ્વરૂપનું તેથી

691) $0.36:1.8 = 6.4:x \quad \therefore x =$ ____

(A) 32 (B) 16 (C) 7.2 (D) 3.2

$0.36:1.8 = 6.4:x$ પરથી $1.8 \times 6.4 = x \times 0.36$

$$\therefore x = \frac{\frac{18}{10} \times \frac{64}{10}}{\frac{36}{100}} = \frac{18 \times 64}{36} = 32$$

$x = 32$

692) DICTIONARY શબ્દને 1234256789 કોડ દ્વારા દર્શાવવામાત્ર આવે છે તો ORDINARY શબ્દને કઇ રીતે દર્શાવી શકાય ?

(A) 59126789 (B) 58126789

(C) 57326789 (D) 56126789

→ D=1, I=2 C=3, T=4 O=5, N=6, A=7, R=8, Y=9 મુજબ ORDINARY = 58126789

693) 10^{10}માં કેટલા શૂન્ય હોય ?

(A) નવ (B) દસ

(C) અગીયાર (D) એકપણ નહી

→ 10^{10} માં જેટલી ઘાત હોય તેટલા શૂન્ય આવે તેથી 10 ઘાત હોય તેથી 10 શૂન્ય આવે.

694) રોહન એક કામ 5 મીનીટમાં પુરુ કરે છે. તો તેનો કામનો દર કામ-સેકન્ડ થાય.

(A) 1/300 કામ/સેકન્ડ (B) 1/5 કામ/સેકન્ડ

(C) 300 કામ/સેકન્ડ (D) 5 કામ/સેકન્ડ

$$\text{કામનો દર} = \frac{\text{કરેલું કામ}}{\text{લાગતો સમય}}$$

$$= \frac{1 \text{ કામ}}{300 \text{ સેકન્ડ}}$$

695) ખાંડના ભાવમાં 20% નો વધારો થાય છે. ગૃહિણીએ વપરાશમાં કેટલો કાપ મુકવો જોઇએ જેથી ખર્ચ વધે નહી?

(A) $\frac{50}{3}\%$ (B) 20% (C) 25% (D) $11\frac{1}{3}\%$

$$\% \text{ ઘટાડો} = \frac{20}{100+20} \times 100 = \frac{100}{6}$$

$$= \frac{50}{3}\% \text{ OR } 16\frac{2}{3}\%$$

696) 80 ના કેટલા ટકા 95 થાય?

(A) 18.75 (B) 118.75

(C) 76 (D) 7.6

$$80 \times \frac{x}{100} = 95 \Rightarrow x = \frac{95 \times 100}{80} = 118.75$$

$x = 118.75$

નોંધ: અહી ગણતરી વગર વધારો લાવવા માટે 100 થી વધુ એકજ વિકલ્પ છે.

697) n અયુગ્મ પૂર્ણાંક હોય તો [illegible] વડે નિઃશેષ ભાગી શકાય છે.

(A) 7 (B) 8 (C) 5 (D) 95

→ n અયુગ્મ સંખ્યા છે તેના વર્ગમાંથી 1 બાદ કરતા તે હંમેશા બેકી સંખ્યા મળે તેથી બેકી સંખ્યા વાળો માત્ર એકજ વિકલ્પ છે 8

698) [illegible] લીપવર્ષમાં 53 રવીવાર આવે તેની સંભાવના.....છે.

(A) $\frac{1}{7}$ (B) $\frac{2}{7}$ (C) $\frac{3}{7}$ (D) $\frac{4}{7}$

લીપવર્ષમાં 1 દિવસ વધારાનો હોય છે તેથી

$$\text{સંભાવના} = \frac{\text{વધારાનો દિવસ}}{\text{કુલ દિવસ}} = \frac{1}{7}$$

699) $\frac{3}{2}, \frac{7}{2}, \frac{11}{2}, \frac{15}{2}$..... સમાંતર શ્રેણીમાં સામા. તફાવત કેટલો છે ?

(A) 2 (B) 4 (C) 3 (D) $\frac{3}{2}$

સામાન્ય તફાવત $d = T_2 - T_1$

= બીજુપદ- પ્રથમ પદ

$$= \frac{7}{2} - \frac{3}{2} = \frac{7-3}{2} = \frac{4}{2} = 2$$

ક્લાર્ક કમ ટાઇપિસ્ટ -18-06-2017

700) $(10^{5.5} \times 10^{5.5}) \div 10^{-4} = 10^?$

(A) 5 (B) 10 (C) 15 (D) 1

→ ગુણાકારમાં ઘાતનો સરવાળો અને ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય તે પરથી

$(10^{5.5} \times 10^{5.5}) \div 10^{-4} = 10^{5.5+5.5-(-4)}$

$= 10^{11+4} = 10^{15}$

701) $(25)^2 \div 25 \times 25 = ?$

(A) 25 <u>(B)</u> 625 (C) 1 (D) એક પણ નહી

→ $(25)^2 \div 25 \times 25 = \frac{25 \times 25}{25} \times 25 = 625$

702) $(25\% \text{ of } 9000) \div 30 \times 2 = ?$

(A) 37.5 <u>(B)</u> 150 (C) 300 (D) 75

9000 ના $25\% \div 30 \times 2 = ?$

$\therefore 9000 \times \frac{25}{100} \div 30 \times 2$

$90 \times 25 \times \frac{1}{30} \times 2 = 150$

703) $(1025 - 225 - 439) \div (486 - 342 - 125) = ?$

<u>(A)</u> 19 (B) 15 (C) 17 (D) 18

$\frac{1025 - 225 - 439}{486 - 342 - 125} = \frac{361}{19} = 19$

704) નીચેમાંથી અવિભાજ્ય સંખ્યા શોધો

1) 841 2) 3481

(A) 841 (B) 3481

(C) 841 અને 3481 <u>(D)</u> એક પણ નહી

→ અહી 841 એ 29 નો વર્ગ છે તેથી વિભાજ્ય છે. 3481 એ 59 નોવર્ગ છે તેથી તે પણ વિભાજ્ય કહેવાય. તો આપેલી એક પણ સંખ્યા અવિભાજ્ય નથી. તેથી <u>d.</u>

705) ......સમાન સંખ્યા છે.

<u>(A)</u> $4/7$ અને $104/182$

(B) $5/2$ અને $155/164$

(C) $144/169$ અને $169/225$

(D) $8/27$ અને $125/216$

→ $\frac{4}{7}$ અને $\frac{104}{182}$ સમાન છે કારણ કે

$\frac{104}{182} = \frac{26 \times 4}{26 \times 7} = \frac{4}{7}$ જ થાય છે તેથી

706) શાળાના પ્રાથના ખંડ માટે $10 \times 8 \times 5$ મી. છે. સદરખંડના $(3 \times 1.5)m^2$ ના બે બારણા અને (2×2) મી.^{2} ની 4 બારી છે. આ ચાર દિવાલોને અંદરથી ચૂનો કરાવવા મટે 1 ચો.મી.નાં રૂ.6 ના ભાવે કુલ ખર્ચ .....થાય.

(A) 1080 <u>(B)</u> 930 (C) 150 (D) એક પણ નહી

ચાર દિવાલનુ ક્ષેત્રફળ $= 2h(l+b)$ $= 2 \times 5(10+8)$ $= 10(18) = 180m^2$	લં. =10 પ. =8 ઉ. =5

આ દિવાલ પર રહેલા બારી, બારણામાં ચુનો ન લગાડાય તેથી

$180 - (2 \times 2) \times (4 \text{ બારી}) - (3 \times 1.5) \times (2 \text{ બારણા})$

$= 180 - 16 - 9 = 180 - 25 = 155m^2$

1 m^2 ના 6 રૂ. હોય તો 155 m^2 ના ? રૂ.	155 x 6=930 રૂ.

707) 7 મી. વ્યાસસવાળો 20m ઉડો કુવો ખોદવમાં આવ્યો. અને તેમાંથી નીકળેલી માટી 20×14 મીટરનો મંચ બનાવવા માટે એક સરખી માટી પાથરવામાં આવી છે તો મંચની ઉંચાઇ કેટલી ?

(A) 7m (B) 11 મી.

<u>(C)</u> 2.75 મી. (D) એક પણ નહી

કુવામાંથી નીકળતી માટી = મંચ પર પથરાતી માટી

$\frac{22}{7} \times \frac{7}{2} \times \frac{7}{2} \times 20 = 20 \times 14 \times h$

માંથી h ને સૂત્રનો કર્તા બનાવતા

$\therefore h \times \frac{22 \times 7 \times 7 \times 20}{7 \times 2 \times 2 \times 20 \times 14} = 2.75$

708) શૂન્ય સીવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો $41/20$ છે તો તે સંખ્યા કઇ છે?

(A) $5/4$ (B) $4/5$

<u>(C)</u> $5/4$ અથવા $4/5$ (D) એક પણ નહી

અહી એક માત્ર વિકલ્પ $4/5 + 5/4 = \frac{41}{20}$ થાય છે

તેથી C વિકલ્પ

709) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમીક ઘનપૂર્ણાંક છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ......છે.

(A) 3 (B) 4 (C) 5 (D) 6

પાયથાગોરસમી ત્રિપુટી 3, 4, 5 એકજ એવી છે જે ક્રમીક હોય તેમાં 3, 4 બાજુના માપ મળે છે તેથી ક્ષેત્રફળ માટે

$A = \frac{1}{2} \times$ પાયો x વેધ $= \frac{1}{2} \times 3 \times 4 = 6$

710) 120, 504, અને 882 નો ગુ.સા.....છે.

(A) 6 (B) 7 (C) 120 (D) એક પણ નહી

$120 = 2 \times 2 \times 3 \times 5 \times 2$

$504 = 2 \times 2 \times 2 \times 3 \times 3 \times 7$ અવયવો પરથી સ્પષ્ટ છે કે

$882 = 2 \times 7 \times 7 \times 3 \times 3$

બધામાં સામાન્ય અંક $= 2 \times 3 = 6$

711) એક ઓરડાની લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ અનુક્રમે 735 cm. 625 cm અને 415 cm. છે આ ત્રણેય માપ માપી કે તેવા મહતમ લંબાઇવાળા સાધનનું માપ કેટલુ થાય ?

(A) 7 cm (B) 5 cm

(C) 9 cm (D) 8 cm

→ જ્યારે લ.સા.અ., ગુ.સા.અ. ના આવા વ્યવહારીક દાખલામાં મહતમ શબ્દ વાપરે ત્યારે ગુ.સા.અ. જ લેવું. અને ન્યુનતમ શબ્દ વાપરે તો લ.સા.અ.લેવુ.

$735 = 147 \times 5$

$625 = 125 \times 5$

$415 = 83 \times 5$

અવયવો પરથી સ્પષ્ટ જણાય છે કે ગુ.સા.અ.=5

712) 15 થી મોટો ન્યુનતમ ઘનપુણાક શોધો કે જેમાથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણીત થાય?

(A) 1125 (B) 1140 (C) 140 (D) 20

ઉપરના દાખલાની સમજુતી મુજબ લ.સા.અ. લેતા

$125 = 5 \times 5 \times 5$

$225 = 5 \times 5 \times 3 \times 3$

તેથી લ.સા.અ. $= 5 \times 5 \times 5 \times 3 \times 3$

$= 1125$

હવે 15 બાદ કરતા કીધુ છે તેથી 1125+15=1140

713) 20 ના બે ભાગ પાડો કે જેથી તેના વર્ગોનો સરવાળો 218 થાય

(A) 12 અને 8 (B) 13 અને 7

(C) 14 અને 6 (D) એક પણ નહી

અહી માત્ર b વિકલ્પ 13 અને 7 એવો છે કે જેના વર્ગોનો સરવાળો $13^2 + 7^2 = 169 + 49 = 218$ થાય તેથી b વિકલ્પ

714) એક વેપારી કુલદાની રૂ. 96 માં વેચે તો પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે, કુલદાનીની પડતર કિંમત કેટલી છે ?

(A) 96 (B) 160 (C) 60 (D) એક પણ નહી

→ ધારો કે પ.કિ. $= x$ રૂ. તો નફો $= x\%$ થશે.

∴ નફો $= \frac{x^2}{100}$ રૂ.થાય નફો = વે.કિ. - પ.કિ. $\frac{x^2}{100} = 96 - x$	$x^2 = 9600 - 100x$ $x^2 + 100x - 9600 = 0$ અવયવ પાડતા $(x+160)(x-60) = 0$ $x = -160$ જે શક્ય નથી. તેથી $x = 60$

715) બે અંકની એક સંખ્યાના અંકોનો ગુણાકર 21 છે જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા જુની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે તો તે સંખયા શોધો.

(A) 73 (B) 37 (C) 27 (D) 72

→ ગુણાકાર 21 થાય તેવા પ્રથમ બે વિકલ્પ છે હવે 36 ઉમેરતા

73 +36=109 જે અદલા બદલી નથી થતા તેથી

37+36=73 જે પરસ્પર બદલાયેલ નંબર મળે છે.

કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર -2, Oct.2012

716) કોઇપણ બનાવ બને તેની સંભાવના કેટલી હોય?

(A) -1 થી 1 (B) 0 થી 1

(C) -1 થી 0 (D) એક પણ નહી

→ યાદ રાખો સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હોય ગાણીતીક રીતે $0 \le P(X) \le 1$ લખાય

717) જો કોઇ બનાવ માટે સંભાવના $P(A)=0$ હોય તો બનાવ

(A) બનશે જ નહી

(B) બનીને જ રહેશે.

(C) બનાવની શકયતા છે.

(D) બનવાની શકયતા નથી

→ યાદ રાખોઃ જે શકય નથી તેની સંભાવના હંમેશા O હોય અને જેના માટે $P(A)=1$ હોય તે બનીનેજ રહેશે.

718) રમવાના 52 પતાની ઢગમાંથી એક પતુ જોયા વગર ઉપાડીએ તો તે કાળીનો એકકો આવે તેની સંભાવના કેટલી?

(A) $1/52$ (B) $13/52$ (C) $4/52$ (D) $1/13$

→ કાળીનો 1 એકકો હોય તેથી તેની સંભાવના $=\frac{1}{52}$

719) શ્રેણીની 10 સંખ્યનો મધ્યક 25 છે. દરેક સંખ્યામાંથી 5 બાદ કરવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય ?

(A) 5 (B) 10 (C) 20 (D) 25

→ દરેકમાંથી 5 બાદ કરતા મધ્યકમાંથી પણ 5 બાદ થશે તેથી નવો મધ્યક $25-5=20$ થશે

720) 1 લાખ રૂ.નું મશીન ખરીદ્યુ, રૂ. 20,000 ટ્રાન્સપોર્ટ ખર્ચ અને 10,000 રૂ. મશીન બેસાડવાનો ખર્ચ આપ્યો. તો મુડીગત ખર્ચ કેટલો?

(A) 1,00,000 (B) 1,20,000

(C) 1,30,000 (D) 1,10,000

કુલખર્ચ = મુડીગત ખર્ચ

=1,00,000, + 20,000+10,000=1,30,000

721) એક સંખ્યાના 5 ગણા કરી તે સંખ્યા ઉમેરતા 360 થાય તો સંખ્યા કઇ હશે ?

(A) 52 (B) 56 (C) 60 (D) 64

ધારો કે સંખ્યા x છે તો હવે તેના 5 ગણા કરીને તેજ ઉમેરતા $x\times5+x=360$ થાય તેથી $6x=360$ થાય તેથી $x=60$

722) શ્રેણીમાં..........માં કયો આંકડો આવશે?

2,4,3,5,_____, 6,5, 7, 6

(A) 5 (B) 6 (C) 7 (D) 4

$2\xrightarrow{+2}4\xrightarrow{-1}3\xrightarrow{+2}5\xrightarrow{-1}4\xrightarrow{+2}6\xrightarrow{-1}5$

723) A, R, C, S, E, T, G,______, ______

(A) X, Z (B) U, I

(C) W, Y (D) V, B

$A\xrightarrow{B}C\xrightarrow{D}E\xrightarrow{F}G\xrightarrow{H}I$

$R\xrightarrow{+1}S\xrightarrow{+1}T\xrightarrow{+1}U$

724) અત્યારે 3 વાગ્યા છે તો 20 મીનીટ પછી ઘડીયાળના નાના અને મોટા કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો થશે ?

(A) 30 (B) 110

(C) 20 (D) 120

ખૂણો=$|30$ક. $-\frac{11}{2}$ મી.$|=|30\times3 - \frac{11}{2}\times20|=|90-110|$

ખૂણો =20

કોન્સ્ટેબલ-2012

725) A, B, C, D, E, F, નામના છ લોકો હરોળકમાં ઉભા છે C, D વચ્ચે કોઇ નથી D ની બાજુમાં F છે, F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. બન્ને છેડા પર કયા બે લોકો હશે?

(A) Aઅને E (B) Aઅને C

(C) F અને A (D) Cઅને D

→ આપેલી રકમ પરથી ગોઠવણી કંઇક આ રીતે થાય છે. E C D F B A તેથી કહી શકાય કે A અને E બન્ને છેડા પર છે.

726) 1 થી 200 ની વચ્ચે 5 થી ભાગી ન શકાય એવા કેટલા આંકડા આવે ?

(A) 39 (B) 40 (C) 140 (D) 160

→ ક્રમીક સંખ્યા હોવાથી $\frac{200}{5}=40$ સંખ્યા એવી છે કે જે 5 વડે ભાગી શકાય તેથી ન ભાગી શકાય તેવી 200-40=160 સંખ્યા છે.

727) 6, 12, 20, 30, 42, ____

(A) 60 (B) 56 (C) 58 (D) 50

$6\xrightarrow{+6}12\xrightarrow{+8}20\xrightarrow{+10}30\xrightarrow{+12}42\xrightarrow{+14}56$

728) 2, 10, 30, 68, ___

(A) 110 (B) 120 <u>(C)</u> 130 (D) 140

$2 \xrightarrow{8+0=8} 10 \xrightarrow{8+12=20} 30 \xrightarrow{20+18=38} 68 \xrightarrow{38+24=62} 130$

729) એક વાહન પ્રથમ 4 કલાક 60 Km/ hr ની ઝડપે પછી 50 Km/ hr ની ઝડપે 6 કલાક સુધી દોડે છે તો તે વાહને કેટલું અંતર કાપ્યુ હશે?

<u>(A)</u> 540 Km (B) 640 Km

(C) 740 Km (D) 800 Km

ઝડપ $= \frac{\text{અંતર}}{\text{સમય}}$ પરથી અંતર = ઝડપ x સમય

60 ની ઝડપે કાપેલુ અંતર $4 \times 60 = 240$, અને 50 ઝડપે કાપેલુ અંતર $= 50 \times 6 = 300$ આમ કુલ 240+300=540 Km અંતર કાપ્યુ હશે.

730) એક માણસ 16 દિવસમાં ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં ખાડો ખોદે છે તો બન્ને ભેગા મળીને ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે?

<u>(A)</u> 16 (B) 24 (C) 32 (D) 36

બન્ને ભેગા મળીને $= \frac{16 \times 8}{16+8} = \frac{16 \times 8}{24} = \frac{16}{3}$

દિવસમાં 1 ખાડો ખોદે તેથી 3 ખાડા માટે

$\frac{16}{3} \times 3 = 16$

731) પિતાની ઉંમર 40 વર્ષ છે મોટા પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 18 વર્ષ ઓછી છે તેનાથી નાના પુત્રની ઉંમર પિતા કરતા 21 વર્ષ નાની છે અને સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે તો સૌથી નાનો અને સૌથી મોટા પુત્ર કરતા કેટલા વર્ષ નાનો હશે ?

(A) 4 (B) 5 <u>(C)</u> 6 (D) 7

પિતાની ઉંમર 40 વર્ષ છે. તેથી મોટાની ઉંમર = 40 – 18= 22વર્ષ થશે. નાના(વચ્ચેના) ની ઉંમર 19 વર્ષ થશે અને સૌથી નાનાની ઉંમર = 19 – 3 = 16 વર્ષ થશે તેથી મોટા અને સૌથી નાના વચ્ચેનો તફાવત = 22 – 16= 6 વર્ષ થશે.

732) વાહન A 50 Km/hr અને B 40 Km/ hr ની ઝડપે એક જ દિશામા જાય છે તો એક દિવસના અંતે બન્ને વચ્ચેનું અંતર કેટલુ હશે ?

(A) 420 Km <u>(B)</u> 240 Km

(C) 340 Km (D) 440 Km

અહી ઝડપ આપેલી છે તેના પરથી સ્પષ્ટ છે કે એક કલાકમાં બન્ને વચ્ચેનું અંતર 10 Km થાય છે તો 24 કલાક (1 દિવસ) નું અંતર = 24 x 10=240 Km થશે.

733) પિતાની ઉંમર પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતા 8 વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે?

(A) 26 <u>(B)</u> 32 (C) 29 (D) 35

પિતા = પુત્ર x3+8, માતા = પિતા +3 આપેલુ છે. પુત્રની 7 વર્ષ ઉંમર મુકતા પિતા $= 7 \times 3 + 8 = 29$ વર્ષ થશે. તેથી માતા = 29+ 3=32 વર્ષ

734) 400 રૂ. ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10%વેચાણ વેરો લગાવીને ગ્રાહકને વેચવામાં આવે છે તે ગ્રાહકે શી કિંમત ચુકવવી પડે ?

<u>(A)</u> 422.4 રૂ. (B) 424.6 રૂ.

(C) 434.4 રૂ. (D) 430.4 રૂ.

400 ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપતા 384 રૂ. મા વેચવા જોઇએ તેના પર 10% વેચાણ વેરો લગાવતા $384 \times \frac{10}{100} = 38.4$ રૂ. વેચાણ વેરો લાગે તેથી $384 + 38.4 = 422.40$ રૂ.

GPSC-1/2 Dec.2014

735) સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઉભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો. તોતે કઇ દિશામાં મોં રાખીને ઉભો હશે ?

(A) પશ્રીમ (B) પૂર્વ <u>(C)</u> દક્ષિણ (D) ઉતર

→ સૂર્યોદય પૂર્વમાંથી થાય ત્યારે પડછાયો પશ્ચિમમાં પડે. તેથી રાજીવની જમણી બાજુ પંશ્રીમ થશે અને રાજીવનું મોં દક્ષિણ દિશામાં હશે.

736) મારી સાસુ અને તમારી સાસુ મા-દિકરી થાય તો મારી અને તમારી વચ્ચે શો સંબંધ હોય?

(A) જમાઇ-નણંદ (B) સાસુ-નણદોઇ

(C) નણંદ-સાસુ (D) પૂત્રવધુ-સસરા

→ પૂત્રવધુની સાસુ એટલે કે તેના પતીની માતા અને સસરાની સાસુ એટલે કે પુત્રવધુના સાસુની માતા થાય તેથી વિકલ્પ d સાચો ગણાય.

737) અનીલાની આજની ઉંમર કરતા તેણીના પિતાની ઉંમર 4 ગણી છે 8 વર્ષ પછી તેણીના પીતાની ઉંમર અનીલા કરતા 3 ગણી થશે તો અનીલાની હાલની ઉંમર કેટલી ?

(A) 16 વર્ષ (B) 14 વર્ષ

(C) 18 વર્ષ (D) 20 વર્ષ

→ અનીલા x 4= પિતાની ઉંમર........(1)

8 વર્ષ પછી (અનીલા) +8 અને પિતા +8 થાય

પિતા અનીલા કરતા 3 ગણી થાય છે તેથી

(પિતા +8) = (અનીલા +8) x3 ....(2)

તેથી પિતા =4 અનીલા સમી ૧ માંથી ર માં મુકતાં

4 અનીલા +8= 3 અનીલા +24

∴1 અનીલા =16 વર્ષ થશે જે હાલની ઉંમર છે.

738) ધારો કે A, C નો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z, Q ની માતા છે. P, Z નો પુત્ર છે. તો કયો સંબંધ સારો થાય.

(A) C, P બન્ને એક બીજાની બહેનો છે.

(B) P, A બન્ને મામા-મામીના ભાઇઓ છે.

(C) P અને A ના મામા છે

(D) Q એ A ના દાદી છે.

→ C અને Q બન્ને બહેનો હોવાથી Q: A ની માસી થશે અને Z નાની થશે તેનો પુત્ર એ A ના મામા થાય.

739) ABCDEF ના માટે સંકેત ZYXWVU વપરાય તો ARGUE માટે ....સંકેત થશે.

(A) ZITFV (B) ZFVIT

(C) ZTIFU (D) ZITUF

A=Z, R=I, G=T, U=F, E=V પરથી ZITFV

740) જો હાથી = કીડી, ભેસ = કીડી, વાંદરો = પંતગીયુ હોય અને મનુષ્ય = વાઘ અને ચામાચીડીયુ = ફુલ હોય તો ફુલ સુંઘનાર કોણ ?

(A) ચામાચીડીયુ (B) વાંદરો

(C) મનુષ્ય (D) કીડી

→ ફુલ પતંગીયુ સુંઘે તેથી વાંદરો.

741) Delhi= 73541 હોય Calcutta= 82589662 થાય હોય Calicut=?

(A) 8251896 (B) 8543691

(C) 5279431 (D) 5278013

→ બન્ને આપેલા શબ્દ ઉકેલતાં જણાય છે કે t=6 થાય તેથી તે પ્રમાણે Cal=825 Cu=89 થાય છે તેથી Calicut= 8251896 થાય

742) જો દુધ અને પાણીના 20 લીટરના મીશ્રણમાં 2% પાણી હોય તો એ મીશ્રણમાં કેટલુ દુધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય?

(A) 19.6 l (B) 20 l (C) 40 l (D) 10 l

→ 20 લીટરમાં 2% પાણી = 0.4 l પાણી તેથી

20- 0.4 = 19. 6 l દુધ હોય

તેમાં ધારો કે x l દુધ ઉમેરવામાં આવે છે.

તેથી $(19.6+x)\times\frac{1}{100}=0.4$

x = 20. 4 l તેથી $x = 20$

743) 60 કીમી/કલાક ની ઝડપે જતી 300 મી. લાંબી રેલગાડીને તે જ દિશામાં જતી 200 m લાંબી રેલ ગાડી 80 Km/કલાક ની ઝડપે જાય છે તેને પસાર કરતા કેટલો સમય લાગશે?

(A) 1.8 મીનીટ (B) 2 મીનીટ

(C) 1.5 મીનીટ (D) 1 મીનીટ

સમય $=\frac{(\text{ટ્રેન}_1+\text{ટ્રેન}_2)}{\text{ઝડપની બાદબાકી}}=\frac{(300+200)}{(80-60)\times\frac{5}{18}}=\frac{18\times500}{20\times5}$

$=90 Sec.=1.5 \min$

744) 7, 11, 15, 19, 23……સમાંતર શ્રેણીમાં કેટલા પદનો સરવાળો 900 થાય?

(A) 20 (B) 15 (C) 21 (D) 18

સરવાળો = S_n = 900, પ્રથમ પદ=7, તફાવત =4

આપેલ છે તેથી $S_n = \frac{n}{2}[2a+(n-1)\cdot d]$ મુકતા

$1800 = n[14+4n-4]$

$1800 = n[14+4n]$

$\therefore 900 = 7n+2n^2$ તો $2n^2+7n-900=0$

ના અવયવ પાડતા

$(2n^2+45n-40n-900)=0$

$\therefore n(2n+45)-20(2n-45)=0$

$\therefore n=20$

745) જો X એ વાસ્તવીક સંખ્યા હોય તો $3x^2-4x+1$ ની ન્યુનતમ કિંમત…….હશે?

(A) $\frac{1}{3}$ (B) $-\frac{1}{3}$ (C) 0 (D) 1

$3x^2-4x+1$ ના અવયવ પાડતા

$3x^2-3x-1x+1=0$

$3x(x-1)-1(x-1)=0$

$(x-1)\ (3x-1)=0$

$\therefore\ x=1$ અને $x=\frac{1}{3}$ જે ન્યુનતમ કિંમત થશે.

746) 1500 રૂ. માં જુની સાયકલ ખરીદી તેના પર 300 રૂ. રીપેરીંગ ખર્ચ અને 2070 માં વેચી તો તેને કેટલા ટકા નફો થાય ?

(A) 18% (B) 20% (C) 12% (D) 15%

→ 1500 ખરીદી + 300 ખર્ચ =1800 પ.કિ.

2070 વે.કિ.-1800 પ.કિ =270 નફો.

$\% = \frac{\text{નફો}}{\text{મૂ.કિ}}\times 100 = \frac{270}{1800}\times 100 = 15\%$

747) એક વસ્તુ પર પ.કિ. પર 25% નફો ચડાવીને વે. કિ. પર 8% વળતર આતે તો તેને કેટલા ટકા નફો મળે?

(A) 15% (B) 14% (C) 17%(D) 20%

નફો $= 25-8-\frac{25\times 8}{100} = 17-2 = 15\%$

748) જો એક રકમ પર 10% વ્યાજના દરે 2વર્ષમાં ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજ વચ્ચે 80 રૂ. તફાવત પડે છે તો તે રકમ……હશે.

(A) 8000 (B) 9680

(C) 10,000 (D) 9600

$D = \frac{PR^2}{(100)^2} \Rightarrow 80 = \frac{P\times 10\times 10}{100\times 100} \Rightarrow P = 8000$

749) 11 Km અંતર કાપવા માટે 6250 પરીભ્રમણ કરે તો આ પૈકીનો વ્યાસ…. હશે.

(A) 28 cm (B) 30 cm

(C) 60 cm (D) 56 cm

6250 પરીભ્રમણ =11000 m

1 પરીભ્રમણ = ?

$\frac{11000}{6250} = 1.76m$

1 પરીભ્રમણ =પરીઘ =$2\pi r$	$2\pi r = 1.76m$ $\pi d = 1.75$
	$d = \frac{176\times 7}{22}$ $d = 0.56m$ $\therefore d = 56cm$

750) n એકથી મોટી નાનામા નાની એવી સંખ્યા હોય કે જેથી 2, 3, 4, 6,કે 7 વડે ભાગતા હંમેશા 1 શેષ મળે છે તો n=_____

(A) 43 (B) 85 (C) 169 (D) 1009

2, 3, 4, 6, 7 નો લ.સા.અ. =84 શેષ 1 વધે છે

તેથી 84+1=85

751) 1989 ને સમાન કેલેન્ડર હવે પછી….. વર્ષમાં આવશે.

(A) 2001 (B) 1997 (C) 1993 (D) 1995

→ લીપ વર્ષ +1 હોવાથી 1989+6=1995

752) રેખા $2x+3y=8$ નો ઉકેલ……છે.

(A) (-2,5) (B) (-2, 4)

(C) (1,2) (D) (-2,3)

અહી b વિકલ્પ આપેલ સમી.નું સમાધાન છે.

$2x+3y = 2(-2)+3(4) = -4+12 = 8$

753) $A = \{1,2,3,4\}$ ને કુલ કેટલા ઉપગણ છે.

(A) 15 (B) 16 (C) 14 (D) 12

સંખ્યા $= 2^n = 2^4 = 16$ અંહી n= સભ્યોની સંખ્યા

754) 500 ના 40% ના 8%=_____

(A) 40 (B) 16 (C) 20 (D) 32

$500 \times \frac{40}{100} \times \frac{8}{100} = 16$

755) દરેક રેખાને ઓછામાં ઓછી..... બીદુ હોય.

(A) 5 (B) અસંખ્ય (C) 3 (D) 2

756) $\frac{2^7 \times 2^6 \times 3^5}{3^4 \times 2^{10}}$ નુ મૂલ્ય શોધો.

(A) 16 (B) 216 (C) 18 (D) 24

$\frac{2^{7+6} \times 3^5}{2^{10} \times 3^4} = 2^3 \times 3 = 24$

757) 107, 99, 96, 111, 99, 88, 99, 110, 105, 109 નો મધ્યસ્થ........છે.

(A) 102 (B) 99 (C) 102.3 (D) 93.5

ચડતા કે ઉતરતા ક્રમમા ગોઠવવા 88, 96, 99, 99 [99, 105] 107, 109, 110, 111 ની વચ્ચે 102 આવે છે.

758) 50 માંથી 51 ગુણ મેળવવાની સંભાવના......છે.

(A) $\frac{1}{4}$ (B) $\frac{1}{2}$ (C) 1 (D) 0

→ જે ઘટના શકય નથી તેની સંભાવના હંમેશા 0 હોય

759) જો + બરાબર ×, − બરાબર ÷, ÷ બરાબર +, અને × બરાબર − હોય તો $20 \div 40 - 4 \times 5 \div 6 = ?$ થાય.

(A) 50 (B) 0 (C) -15 (D) 15

$20 \div 40 - 4 \times 5 \times 6 = 20 + 40 \div 4 - 5 \times 6$

$= 20 + \frac{40}{4} - 5 \times 6$

$= 20 + 10 = 30 = 0$

760) $\frac{1}{2}$ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે?

(A) 4 (B) $\frac{1}{2}$ (C) 2 (D) $\frac{1}{4}$

$\frac{1}{2}$ ના અડધા $\frac{1}{4}$ થાય, તેને 4 વડે ગુણતા 1 આવે.

761) 5^n નો અંતિમ અંક....છે.

(A) 4 (B) 0 (C) 5 (D) 2

→ 5^n નો અંતિમ અંક હંમેશા 5જ આવે.

762) 64, 125, 216, 343,_____

(A) 506 (B) 449 (C) 512 (D) 498

$4^3 5^3, 6^3, 7^3, 8^3=512$

763) $(1)^{1000}-(1000)^0=$___

(A) 999 (B) 0 (C) 1 (D) 1000

$(1)^{1000}=1$ અને $(1000)^0=1$

તેથી બાદબાકી=0

764) બે સંખ્યાનો ગુ.સા.અ. 8 છે અને ગુણાકાર 384 છે તો તેનો લ.સા.અ........છે.

(A) 16 (B) 24 (C) 42 (D) 48

લ.સા.અ. x ગુ.સા.અ. = a x b

લ.સા.અ. x 8 = 384

∴ લ.સા.અ. =48

765) પ્રત્યેક ચાર ક્રમીક ધન પૂર્ણાંકનો ગુણાકાર ...... વડે વિભાજ્ય છે.

(A) 32 (B) 16 (C) 48 (D) 24

ચાર ક્રમીક ધન નાનામા નાની સંખ્યા 1 2 3 4 હોય તો $1 \times 2 \times 3 \times 4 = 24$ થશે

766) ત્રણ ભિન્ન અસમરેખા બિંદુમાંથી......... વર્તુળ પસાર થાય છે.

(A) અનંત (B) એક (C) શૂન્ય (D) ત્રણ

→ યાદ રાખો.

એક બિંદુમાંથી અનંત વર્તુળ પસાર થાય.

બે બિંદુમાંથી અનંત વર્તુળ પસાર થાય.

ત્રણ બિંદુમાંથી એકજ વર્તુળ પસાર થાય.

767) નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગોનો સરવાળો .....થાય.

(A) 25 (B) 10 (C) 20 (D) 5

→ નાની વિભાજ્ય સંખ્યા 4 છે અને નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. તો તેના વર્ગ $4^2=16$, અને $2^2=4$ નો સરવાળો 16+4=20 છે.

768) $\frac{18}{5^3}$ ને દશાંશ ચિહ્ન પછી.......અંકો છે.

(A) 2 (B) 5 (C) 4 (D) 3

$\frac{18}{5^3} = \frac{18}{125} = 0.144$ આમ 3 અંકો છે.

769) $4 \times 16 \times 16 \times 64 = b^4$ તો b=____

(A) 8 (B) 12 (C) 14 (D) 16

$b^4 = 4 \times 16 \times 16 \times 64$

$\therefore b = \sqrt[4]{4 \times 16 \times 16 \times 64}$

$\therefore b = 16$

770) 400 m લાંબી ટ્રેન 80 Km/hr ની ઝડપે દોડતા ફાટક આગળથી નીકળતા કેટલી સેકંડમાં પસાર થશે ?

(A) 12 (B) 18 (C) 24 (D) 30

ઝડપ $= \frac{\text{અંતર}}{\text{સમય}} \Rightarrow$ સમય $= \frac{\text{અંતર}}{\text{ઝડપ}}$

$= \frac{400 \times 18}{80 \times 5} = 18\ Sec$

771) 1000 રૂ. નું 3 વર્ષનું 10% લેખે સાદુવ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત....રૂ. હોય.

(A) 30 (B) 31 (C) 32 (D) 34

ત્રણ વર્ષ માટેની Short cut:

$D = \frac{PR^2(300+R)}{(100)^3}$

$= \frac{1000 \times 10 \times 10 \times (300+10)}{100 \times 100 \times 100}$

$D = 31$

772) સસલા અને રીંછનું વજન 85 Kg. છે. રીંછ અને કુતરા નુ વજન 100 Kg છે તથા સસલા અને કુતરાનુ વજન 65 Kg છે તો સસલાનુ વજન..... હશે.

(A) 30 Kg (B) 20 Kg

(C) 25 Kg (D) 15 Kg

સસલુ +રીંછ =85 રીંછ +કુતરુ =100 સસલુ + કુતરુ =65	સસલુ +રીંછ +કુતરુ =125 માં રીંછ + કુતરુ =100 મુકતા ∴ સસલુ + 100=125
2 (સસલુ +રીંછ +કુતરુ) =250 ∴ સસલુ +રીંછ +કુતરુ =125	∴ સસલુ =25 Kg થાશે

773) $64 \times 81 = (?)^2$ તો ?=____

(A) 72 (B) 56 (C) 27 (D) 44

$(?)^2 = 64 \times 81$ છે તો $(?) = \sqrt{64 \times 81}$

$? = 8 \times 9 = 72$

774) ખુલ્લા નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ......છે.

(A) $4\pi r^2$ (B) $4\pi rh$

(C) $2\pi rh$ (D) $2\pi r(r+h)$

→ ખુલ્લો નળાકાર હોવાથી વિકલ્પ -C

જો બંધ નળાકાર હોય વિકલ્પ -D

775) રૂ. 5 ના સિક્કાનો આકાર........છે.

(A) નળાકાર (B) શંકુ

(C) સમઘન (D) અર્ધગોલક

રૂ. 5 ના સીકકાનો આકાર નળાકાર હોય છે.

776) બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શકય પરીણામો મળે ?

(A) 12 (B) 18 (C) 36 (D) 24

→ બે પાસા એક સાથે ઉછાળતા શકય પરીણામ =36 મળે.

→ એક પાસો ઉછાળતા શકય પરીણામ =6 છે.

777) એક ટેબલ 900 રૂ. માં વેચતા 10% નફો થાય છે. તો 1215 રૂ.માં વેચતા કેટલા ટકા ફાયદો થાય?

(A) 30% (B) 40% (C) 50%(D) 60%

વે.કિ. મૂ.કિ. 110 100 900 ?	$= \frac{900 \times 100}{110} = 818.18$ મૂ.કિ. છે. જેનો 1215

રૂ. માં વેચતા 396. 61 રૂ. નફો થાય.

$\therefore \%$ નફો $= \frac{396.61}{818.18} \times 100 = 48.5 = 50\%$